


UNIVERSITY
OF
TORONTO
LIBRARY

UNIVERSITY OF TORONTO LIBRARY



3 1761 01660170 0





DICTONARIUM
SYRIACO-LATINUM

B894d


حَدَّ

حَدَّ حَدَّ حَدَّ




DICTIONARIUM

SYRIACO-LATINUM



AUCTORE

J. BRUN S. J.




BERYTI PHœNICIORUM

8438
9 | 09
2 |

TYPOGRAPHIA PP. SOC. JESU

1895



AD BENEVOLUM LECTOREM.

Syriacæ linguæ quantus debeatur honos, id plurima ratione in dies manifestius apparet. Tanti enim sunt momenti ea quæ magis magisque in lucem eduntur Syrorum opera, ut vix erudi-
ti nomen præ se ferre valeat, qui ea primoribus saltem labris non attigerit. Ecclesiasticarum vero scientiarum studiosos huic linguæ magis addictos decet, tum propter ejus cum heb-
raica lingua affinitatem, tum propter innumera eruditionis ec-
clesiasticæ monumenta, eaque antiquissima a Syris auctoribus exarata. His adde quod veteres ipsi Patres Græci Latinique ad versionem quam vocant *Simplicem* non semel appellaverint, ut genuinum assequerentur Scripturæ sensum. Quid quod Novum Testamentum etsi græce conscriptum aramaicam per-
petuo dicendi formam redoleat.

Ut tales tantique thesauri studiosæ Clericorum præsertim juventuti magis essent in usu, adjumentum aliquod scholaribus præbere nobis venit in animum, lexicumque componere Syriaco-latinum quod nec classici, ut aiunt, operis limites ex-
cederet, nec nimis jejunam verborum locutionumve materiam subministraret. Quem scopum utrum attigerimus necne, id lectoris benevoli judicio relinquimus; at certe labori vigiliis-
que sciat nos minime pepercisse.

Materiam operis nostri præcipuam inde desumpsimus, unde hauserunt ipsi lexicographi recentiores, apud antiquos scilicet auctores Syros Bar-Bahlul et Bar-Ali, quorum opera, partim a DD. Duval et Hoffmann excusa, partim manuscripta, cum in nostra Orientali Bibliotheca asservantur, tum comiter nobis a Superioribus Collegiorum *Ain-Waraqa* Maronitarum et *Scharfē* Syrorum commodata fuerunt. Karmseddanium etsi forte infe-
rioris notæ auctorem non negleximus, cum plura et ipse ex



antiquioribus excerpserit. Recentiorum vero lexica uti Castelli, Bernstein, Payne-Smith, Cardahi et nuper Brockelmann, aliorumque, de syriacis litteris tam bene meritorum, haud parvum describendo operi nostro subsidium contulerunt.

Methodus vero nostra perquam facilis et obvia est, jamque communiter obtinet inter linguarum Orientalium studiosos: omnia namque syriaca verba ad radicem plerumque trilitteralem retulimus, e qua cœtera derivata veluti flumen e fonte diminant. Quod si quæ voces magis intricatam formam induant, specialem de iis fecimus mentionem in ordine alphabetico cum radicis indicatione. Quod ad peregrinas, græcas præsertim, voces attinet, eas in alphabetica serie censuimus referendas quoties nimis alienam a genio linguæ syriacæ formam præ se ferant, secus si ad normam accedant syriacarum vocum. Quæ verba græca aliquando vocalibus syriacis instruximus, cum sæpe istis destituta vocalibus ab auctoribus relata sint.

Syriacas radices singulas fere singulis Hebræorum Arabumque radicibus opposuimus ut ex trium linguarum collatione sensus primogenius innotesceret, utque Orientalibus qui latine nesciunt sensum vocis generalem indicaremus.

Mirabitur forte eruditorum aliquis plura nos transcripsisse quæ magis ad grammaticam quam ad lexicum referenda videntur; id ex industria a nobis actum est, ut tirones scholares cum elementis difficultatibusque syriacæ linguæ magis assuescerent, et a tædio iterum revolvendi grammaticam essent ex parte imunes. Inde est quod notata sæpe fuerint nominum genera, pluralium formæ etiam regulares, constructi status, substantivorum modificationes cum suffixis pronominibus, item verborum futura, conjugationes difficiliores aliaque nonnulla quæ ab auctoribus primæ notæ decerpsumus. Locutiones autem syriacæ cœteraque exempla a nobis citata, sæpenumero e Syris scriptoribus collecta sunt, etsi id brevitatis causa notandum non judicavimus.

De typographica nostri lexici executione pauca addemus. Syriaci quibus usi sumus characteres, a laicis Fratribus nostræ Societatis descripti et proculsi sunt; elegantioris formæ typos referunt, junctasque habent sibi vocales. Horum jam quædam dedit specimina D. Graffin in notis titulisque grandioribus primi voluminis *Patrologie Syriacæ*.

Ancipites aliquando hæsimus an supplementum aliquod huic operi adjiciendum esset, tum ad voces quasdam novas addendum, tum ad complendas quasdam explicationes in priori lexici parte omissas; e judicio tamen gravium virorum, id postponendum esse visum fuit. Quæ certe omissa verba si syriaca sint facile ex radicis derivatorumque comparatione dignosci poterunt, si græca aut latina a forma peregrina deprehendentur. Exemplo sint: مَسْنَنْ مَرْخَلْ relaxatio, remissio, a radice رَخْلَ respiravit; حُمَّلْ humiliatio, a voce حَمَّلْ infra; وَهَمَّلْ et وَسَكَنْ خَلْεκτρον, succinum; وَهَوْفَدْ ئَغْوَدْιον, viaticum; وَهَمَّلْ بَاسِلِيكَنْ basilicæ; لَيْرَهَ بَارْبِيتَوس, lyra; اِنْدُلْجَنْ indulgentia; اِرْجَنْ orarium. Hæc aliaque similia, si Deo libuerit, in novam editionem operis distulimus.

Huic nostræ præfationi finem imponere nolumus antequam gratos exhibeamus animi sensus erga DD. Duval et Land, viros in litteris syriacis imprimis doctos, qui lexici folia legere multisque notis ornare non dedignati sunt. Plurimas item iis nostræ Societatis Patribus agimus gratias qui suo fraterno concursu hunc arduum laborem temperarunt et ad finem usque operis adminiculum ferre non destiterunt.



EXPLICATIO

VOCUM COMPENDIOSE SCRIPTARUM

<i>abs.</i>	: absolute <i>vel</i> abso-	<i>commun.</i>	communius.
	latus status.	<i>compar.</i>	comparativum.
<i>acc., accu.</i>	accusativus.	<i>contr.</i>	contractus.
<i>act.</i>	activum, active.	<i>conj.</i>	conjunction, con-
<i>adhib.</i>	adhibitum.	<i>junctive.</i>	
<i>adj.</i>	adjectivus, adjecti-	<i>conf.</i>	conflatum.
	ve.	<i>compos.</i>	compositum.
<i>adv.</i>	adverbium, adver-	<i>corrupt.</i>	corrupta vox.
	bialiter.	<i>est.</i>	constructus status.
<i>aethiop.</i>	aethiopice.	<i>demonst.</i>	demonstrativum.
<i>aff.</i>	affixa.	<i>den.</i>	denominativus, de-
<i>al.</i>	alius; alii auctores.		nominative.
<i>Alchim.</i>	Alchimistæ.	<i>deriv.</i>	derivatum, derivata.
<i>aliq.</i>	aliquis.	<i>dim.</i>	diminutivum.
<i>antonom.</i>	antonomastice.	<i>disjunct.</i>	disjunctive.
<i>Aph.</i>	Aphel.	<i>dubit.</i>	dubitativum.
<i>ap.</i>	apud.	<i>emph.</i>	emphatice; empha-
<i>ar.</i>	arabice		ticus status.
<i>aram.</i>	aramaica dialectus.	<i>e. g.</i>	exempli gratia.
<i>arm.</i>	armenice.	<i>epenth.</i>	epenteticum <i>h. e.</i>
			additum.
<i>assyr.</i>	assyriace.	<i>Eschtaph.</i>	Eschtaphal.
<i>astron.</i>	astronomi.	<i>Ethpe.</i>	Ethpeel.
<i>c.</i>	communis generis;	<i>Ethpa.</i>	Ethpaal.
	cum.	<i>Ethpai.</i>	Ethpaial.
<i>c. v. s.</i>	cum vel sine.	<i>Ethpal.</i>	Ethpalal.
<i>cf., cfr.</i>	confer.	<i>Ettaph.</i>	Ettaphal.
<i>chald.</i>	chaldaice.	<i>ex.</i>	exemplum.
<i>coll.</i>	collective.		

<i>explet.</i>	expletivum.	<i>n., nom.</i>	nomen.
<i>extens.</i>	extensio.	<i>nng.</i>	nonnunquam.
<i>f., fem.</i>	femininum.	<i>Occident.</i>	Occidentales Syri.
<i>f., fil.</i>	filius.	<i>Orient.</i>	Orientales Syri.
<i>fl.</i>	flumen.	<i>oppos.</i>	oppositum, opposi- tio.
<i>fr.</i>	frater.	<i>P., part.</i>	participium.
<i>fut.</i>	futurum.	<i>p., pers.</i>	persona.
<i>heb.</i>	hebraice.	<i>Pa.</i>	Pael.
<i>gall.</i>	gallice.	<i>Pe.</i>	Peal.
<i>gram.</i>	grammatice.	<i>Palp.</i>	Palpel.
<i>gr., græc.</i>	græce.	<i>pass.</i>	passivum.
<i>guttur.</i>	gutturales litteræ.	<i>pers.</i>	persice.
<i>i. e.</i>	id est.	<i>Pi.</i>	Piel <i>forma hebraica</i> .
<i>id.</i>	idem.	<i>pler.</i>	plerumque.
<i>indefin.</i>	indefinitum.	<i>plur.</i>	plurale.
<i>interr.</i>	interrogativum.	<i>poet.</i>	poetæ ; poetice.
<i>inus.</i>	inusitatum.	<i>præc.</i>	præcedens.
<i>inf.</i>	infinitivum.	<i>præf.</i>	præfixa.
<i>imp.</i>	imperator.	<i>præp.</i>	præpositio, præpo- sitive.
<i>imper.</i>	imperativum.	<i>præs.</i>	præsens.
<i>impers.</i>	impersonaliter.	<i>præt.</i>	præteritum.
<i>it.</i>	item.	<i>pron.</i>	pronomen.
<i>lat.</i>	latine, vox latina.	<i>prosth.</i>	prostheticum, <i>h. e.</i> initio additum.
<i>lit.</i>	litteræ.	<i>prov.</i>	provincia.
<i>log.</i>	logici.	<i>pr. m.</i>	<i>nomen</i> proprium masculinum.
<i>m., masc.</i>	masculinum.	<i>pr. f.</i>	<i>nom.</i> proprium fe- mininum.
<i>mart.</i>	martyr.	<i>q.</i>	quod.
<i>mathem.</i>	mathematici.	<i>q. v.</i>	quod videas.
<i>metaph.</i>	metaphorice.		
<i>neolog.</i>	neologismus,		
<i>Nestor.</i>	Nestoriani.		
<i>Niph.</i>	Niphal, <i>forma heb-</i> <i>raica verbi.</i>		

<i>r., rad.</i>	radix : radicalis.	<i>syr.</i>	syriace.
<i>refl.</i>	reflexum.	<i>talm.</i>	talmudice.
<i>relat.</i>	relativum.	<i>tant.</i>	tantum.
<i>s.</i>	seu, sub ; sine.	<i>targum.</i>	targumiçe.
<i>Schap.</i>	Schapel	<i>termin.</i>	terminatio.
<i>S.</i>	Sanctus, Sancta.	<i>trop.</i>	tropice.
<i>seq.</i>	sequens, etc.	<i>u.</i>	urbs.
<i>sing.</i>	singularis.	<i>usit.</i>	usitatum ; usita-
<i>scil.</i>	scilicet.		tius.
<i>spec.</i>	speciatim.	<i>usurp.</i>	usurpatum.
<i>scrib.</i>	scribitur.	<i>v.</i>	vide ; verbum.
<i>st. c., stc.</i>	status constructus.	<i>v. g.</i>	verbi gratiâ.
<i>subaud.</i>	subauditum.	<i>v. s.</i>	vide sub.
<i>subst.</i>	substantivum, sub-	<i>virg.</i>	virgo.
	stantive.		



أَخْدَنْتَهُ id.	أَخْدَنْتَهُ id. patrem fecit.
أَخْدَنْتَهُ id. res amissa.	أَخْدَنْتَهُ pater factus est.
أَخْدَنْتَهُ , أَخْدَنْتَهُ perditus, miser,	أَخْدَنْتَهُ , أَخْدَنْتَهُ id.
destitutus aliquā re: animo, fama, mente.	أَخْدَنْتَهُ vel أَخْدَنْتَهُ paternitas.
أَخْدَنْتَهُ pernicies, amissio.	أَخْدَنْتَهُ paternus, patrius.
أَخْدَنْتَهُ perdens, perditor.	أَخْدَنْتَهُ regulus, alter a rege, patricius.
أَخْدَنْتَهُ pernicies, amissio, destructio.	أَخْدَنْتَهُ patriè, patris more.
أَخْدَنْتَهُ éβδομάδα, septimana.	أَخْدَنْتَهُ , pl. أَخْدَنْتَهُ ; pl. أَخْدَنْتَهُ , et أَخْدَنْتَهُ fructus, pomum, ramus.
أَخْدَنْتَهُ c. præf. , instar, sicut; it. continuo;	أَخْدَنْتَهُ , pl. أَخْدَنْتَهُ vel أَخْدَنْتَهُ calamus, fistula, tuba, organum.
cfr. in hoc sensu ar. أَبْدَنْتَهُ .	أَخْدَنْتَهُ , pl. أَخْدَنْتَهُ arundo.
أَخْدَنْتَهُ ἀποκάλυψις, Apocalypse.	أَخْدَنْتَهُ , pl. أَخْدَنْتَهُ amussis, canalis, rallum arantis.
أَخْدَنْتَهُ vestibulum, limen, porta; — agmen camelorum,	أَخْدَنْتَهُ claudus.
cfr. أَخْدَنْتَهُ .	أَخْدَنْتَهُ claudicatio.
أَخْدَنْتَهُ obolus.	أَخْدَنْتَهُ , fut. أَخْدَنْتَهُ periit, excidit, amissus est, deletus est.
أَخْدَنْتَهُ chirographum, rota, rota aquaria; seminator, arator; cfr. حَدْنَوْا et حَدْنَوْا , ar. بَزْر .	أَخْدَنْتَهُ , pl. أَخْدَنْتَهُ perdidit, occidit, delevit, dissipavit, extinxit, irritum fecit.
أَخْدَنْتَهُ bicristatus.	Ettaph. أَخْدَنْتَهُ perditus est, etc.
أَخْدَنْتَهُ contristatus est, luxit.	Aph. أَخْدَنْتَهُ perditio, exitium, locus perditionis; sepulcrum.
Ethpe. أَخْدَنْتَهُ id.	domus perditionis: pernicious.
أَخْدَنْتَهُ luctus, tristitia.	أَخْدَنْتَهُ exitialis, perniciosus.
أَخْدَنْتَهُ perditio.	أَخْدَنْتَهُ perditio.

- | | | | |
|-----------|---|----------|--|
| أَحْمَلٌ | tristis, lugens, eremita. | أَحْمَلٌ | f. ἀγορά, forum. |
| أَحْكَمٌ | tristis, flebilis. | أَحْمَمٌ | pl. أَحْمَمٌ ἀγρός, ager. |
| أَحْدَادٌ | , pl. أَحْدَادٌ, cfr. | أَحْمَمٌ | ἀγυρτής, subdiaconus. |
| أَحْدَادٌ | agmen camelorum, caterva, cœtus. | أَحْمَمٌ | spado ; vide أَهْمَمٌ . |
| أَحْمَلٌ | camelorum pastor; cfr. | أَحْمَمٌ | ἄγιος, sanctus. |
| أَحْمَلٌ | . | أَحْمَمٌ | أَنْجِلَا, sancta. |
| أَحْتَارٌ | c., pl. أَحْتَارٌ lapis, cumulus lapidum, signum; | أَحْمَمٌ | v. أَحْمَمٌ . |
| أَحْتَارٌ | أَحْتَارٌ وَفُمَلٌ lapis scandali ; | أَحْمَمٌ | أَحْمَمٌ, vide أَحْمَمٌ . |
| أَحْتَارٌ | أَحْتَارٌ وَفُمَلٌ lapis horarum: horologium. | أَحْمَمٌ | أَحْمَمٌ et أَحْمَمٌ, vide أَحْمَمٌ . |
| أَحْمَمٌ | vel أَحْمَمٌ vel أَحْمَمٌ | أَحْمَمٌ | أَحْمَمٌ, f., pl. أَحْمَمٌ |
| أَحْمَمٌ | أَحْمَمٌ, ebenus: | أَحْمَمٌ | vas, pelvis, crater, |
| أَحْمَمٌ | أَحْمَمٌ, abbas. | أَحْمَمٌ | hydria. |
| أَحْمَمٌ | pulvis, arena. | أَحْمَمٌ | fut. أَحْمَمٌ conduit |
| أَحْمَمٌ | pl. أَحْمَمٌ ala, penna. | أَحْمَمٌ | pretio, subornavit; <i>habet nom.</i> |
| أَحْمَمٌ | plumbum. أَحْمَمٌ plumbeus. | أَحْمَمٌ | pers. <i>in accus.</i> vel præc. أَحْمَمٌ , |
| أَحْمَمٌ | juncus, planta papyracea. | أَحْمَمٌ | <i>nom. pretii præc.</i> أَحْمَمٌ . |
| أَحْمَمٌ | asa foetida. | Ethpe. | : أَحْمَمٌ pass. |
| أَحْمَمٌ | أَحْمَمٌ ἀγωγός, canalis, aqueductus. | Pa. | : أَحْمَمٌ sicut Pe. - it. locavit; |
| أَحْمَمٌ | أَحْمَمٌ aquæ investigator. | | cfr. etiam : أَحْمَمٌ et : أَحْمَمٌ . |
| أَحْمَمٌ | أَحْمَمٌ ἀγών, pl. أَحْمَمٌ certamen. | Ethpa. | : أَحْمَمٌ negotiatus est, |
| أَحْمَمٌ | agonia. | | acquisivit; cfr. : أَحْمَمٌ . |
| أَحْمَمٌ | et أَحْمَمٌ ἀγωνιστής, athleta. | Aph. | : أَحْمَمٌ locavit, mercaturam fecit. |
| أَحْمَمٌ | vel أَحْمَمٌ scutella, laguncula; cfr. أَحْمَمٌ . | | : أَحْمَمٌ, أَحْمَمٌ merces, præmium. |
| | | | أَحْمَمٌ, pl. أَحْمَمٌ conductor, vel etiam lateres cocti; et in hoc sensu cfr. arab. جَرْجَة vel assyr. agurru. |

جَنْدِيٌّ، جَنْدِيٌّ؛ pl. جَنْدِيٌّ con-
ductus pretio, mercenarius,
catechumenus.

جَنْدِيٌّ more mercenarii.

جَنْدِيٌّ merces, stipendum,
conditio mercenaria, conduc-
tio. — exilium, pro جَنْدِيٌّ.

جَنْدِيٌّ auctoramentum, arrha.

جَنْدِيٌّ merces, pretium.

جَنْدِيٌّ merces, *vide* جَنْدِيٌّ.

جَنْدِيٌّ، اَجْنَادِيٌّ، studiosus sapientiae
spontaneus: *nomen proprium*.

جَنْدِيٌّ tectum; جَنْدِيٌّ *silius*
tecti: daemon epilepticum ve-
xans.

جَنْدِيٌّ، pl. جَنْدِيٌّ epistola,
inscriptio, pagina; assyr. egir-
tu.

جَنْدِيٌّ، dim. epistolium.

جَنْدِيٌّ scriba.

جَنْدِيٌّ vel جَنْدِيٌّ fornax, fornax
ardens.

جَنْدِيٌّ olla magna.

جَنْدِيٌّ juncus, fibræ palmarum.

جَنْدِيٌّ adduxit; cfr. جَنْدِيٌّ.

جَنْدِيٌّ lepidum.

جَنْدِيٌّ Ursa major *constellatio*.

جَنْدِيٌّ، pl. جَنْدِيٌّ cinnabaris,
minium; in pl., fores geminæ.

جَنْدِيٌّ Adamus.

جَنْدِيٌّ terrestris, terrenus; ad
Adamum pertinens.

جَوْهَرٌ terra.

جَوْهَرٌ terrenus.

جَوْهَرٌ آذَافِيَّا vel جَوْهَرٌ،
آذَافِيَّا adamas.

جَوْهَرٌ آذَافِيَّا adamantinus.

جَوْهَرٌ f., pl. جَوْهَرٌ et جَوْهَرٌ، auris,
ansa. — it. sinus maris, uter,
promontorium. جَوْهَرٌ tumor glandularum sub auri-
bus.

جَوْهَرٌ auricula.

آدَمِيٌّ، آدَمِيٌّ Dominus.

جَوْهَرٌ آذَافِيَّا sesamum.

جَوْهَرٌ آذَافِيَّا area, horreum.

جَوْهَرٌ m., mensis Syrorum fere
Martio respondens.

جَوْهَرٌ آذَافِيَّا ilex, cedrus.

جَوْهَرٌ آذَافِيَّا area parva, cubiculum.

جَوْهَرٌ آذَافِيَّا آذَافِيَّا idolum, simu-
lacrum.

جَوْهَرٌ آذَافِيَّا، *vide* جَوْهَرٌ.

جَوْهَرٌ — Pa. جَوْهَرٌ dissimulavit,
siluit, obturavit; *hinc* negle-
xit; *nnq.* percussit, specifi-
cavit; *cum* جَوْهَرٌ, supersedit,
cessavit.

جَوْهَرٌ et جَوْهَرٌ negligentia,
incuria, silentium.

جَوْهَرٌ مَبْحَرٌ part. v. جَوْهَرٌ .
جَوْهَرٌ id. q. مَبْحَرٌ .

جَوْهَرٌ، اَجْوَهَرٌ elōos, forma, modus,

جَوْهَرَ	concors, familiaritate junc-
جَوْهَرَ	tus, consentiens, unanimis.
جَوْهَرَ	Ethpe. جَوْهَرَ societatem initit.
جَوْهَرَ	Pa. جَوْهَرَ conjunxit, reconcilia-
جَوْهَرَ	vit, unanimem fecit.
جَوْهَرَ	Ethpa. جَوْهَرَ, cum مَعَ et
جَوْهَرَ	معاً sibi conciliavit, consensit.
جَوْهَرَ	Ettaph. جَوْهَرَ coaluit.
جَوْهَرَ	جَوْهَرَ, جَوْهَرَ et جَوْهَرَ mansio,
جَوْهَرَ	habitaculum, pagus.
جَوْهَرَ	جَوْهَرَ convenientia, confoede-
جَوْهَرَ	ratio, consensus, unanimitas.
جَوْهَرَ	جَوْهَرَ, f. جَوْهَرَ; pl. جَوْهَرَ et جَوْهَرَ
جَوْهَرَ	familiaris, concors.
جَوْهَرَ	جَوْهَرَ unanimiter.
جَوْهَرَ	جَوْهَرَ, pl. جَوْهَرَ signum, prodi-
جَوْهَرَ	gium, miraculum; signum
جَوْهَرَ	viam indicans, cippus; littera,
جَوْهَرَ	tessera, sigillum, typus; indi-
جَوْهَرَ	cium, vestigium, pignus; it.
جَوْهَرَ	in pl. lineaienta manus vel
جَوْهَرَ	vultus.
جَوْهَرَ	جَوْهَرَ, pl. جَوْهَرَ signum, littera,
جَوْهَرَ	notae litterarum.
جَوْهَرَ	جَوْهَرَ et جَوْهَرَ, it. جَوْهَرَ mansio,
جَوْهَرَ	habitaculum, conclave.
جَوْهَرَ	جَوْهَرَ, جَوْهَرَ, ride جَادَ.
جَوْهَرَ	جَوْهَرَ et جَوْهَرَ ocyrum, rhus
جَوْهَرَ	coriaria.
جَوْهَرَ	جَوْهَرَ εὔγε, euge!
جَوْهَرَ	جَوْهَرَ titio, stipes, baculus; cfr.
جَوْهَرَ	ar. عُودَ.
جَوْهَرَ Pe. usurp. tant. in part.	

فَلَبَّى، وَفَلَبَّى flabellum.
 فَلَبَّى instrumentalis.
 رَانَةً، fe.; pl. رَانَاتٍ rana.
 تَمْوِيْدٌ ظَهَرٌ، terminus.
 فَلَوْنَى، vide فَلَوْنَى.
 فَلَوْنَى، pl. لَوْنَى præsepe; vide فَلَوْنَى.
 فَلَقْمَانٌ lex mosaïca i. e. Pentateuchus; cfr. חַדְרָה .
 فَلَقْمَانٌ، pl. فَلَقْمَانٌ pomarium.
 فَلَقْمَانٌ مَكْبُرٌ εὐφορκύδησιν, Euro-aquilo.
 فَلَحْمَانٌ admissarius; trop. lascivus.
 فَلَحْمَانٌ، pl. فَلَحْمَانٌ حَسَنَةٌ salva quæsio, hosanna: vox faustæ et devoteæ acclamationis.
 فَلَحْمَانٌ دَيْنَارٌ dies Palmarum.
 فَلَحْمَانٌ، pl. فَلَحْمَانٌ، et فَلَحْمَانٌ caligo, tenebræ; cfr. حَسَنَةٌ .
 فَلَحْمَانٌ αὐθεντία, potestas, jurisdictionis, præfectura.
 فَلَحْمَانٌ vel فَلَحْمَانٌ pilus pubis.
 فَلَحْمَانٌ pilosus.
 فَلَحْمَانٌ vel فَلَحْمَانٌ bos, taurus, bubalus admissarius.
 فَلَحْمَانٌ، pl. فَلَحْمَانٌ fornix, porticus, villa.
 فَلَحْمَانٌ vel فَلَحْمَانٌ، pl. فَلَحْمَانٌ legatus, nuntius.
 فَلَحْمَانٌ فَلَحْمَانٌ legatio, apostolatus.
 فَلَحْمَانٌ it. فَلَحْمَانٌ ζύγωμα,

lignum superius portæ in quo cardo volvitur; vide فَلَحْمَانٌ .
 فَلَحْمَانٌ fut. فَلَحْمَانٌ, imp. فَلَحْمَانٌ, inf. فَلَحْمَانٌ et فَلَحْمَانٌ، part. فَلَحْمَانٌ ivit, abiit, profectus est, decessit, processit; — seq. فَلَحْمَانٌ adduxit. فَلَحْمَانٌ دَعْنَى comitatus est eum.
 فَلَحْمَانٌ utilis, conveniens; et in hoc sensu non occultatur فَلَحْمَانٌ .
 فَلَحْمَانٌ، فَلَحْمَانٌ vel فَلَحْمَانٌ rete; targ. فَلَحْمَانٌ heb. فَلَحْمَانٌ, ar. فَلَحْمَانٌ nevit; cfr. فَلَحْمَانٌ .
 فَلَحْمَانٌ viator.
 فَلَحْمَانٌ iens, abiens; abitus.
 فَلَحْمَانٌ مَحَاجَدٌ، مَحَاجَدٌ ambulatio.
 فَلَحْمَانٌ vel فَلَحْمَانٌ profectio; فَلَحْمَانٌ مَحَاجَدٌ profectio in bellum, peregrinatio pia, فَلَحْمَانٌ مَهْوَسَدٌ iter nocturnum.
 فَلَحْمَانٌ، pl. فَلَحْمَانٌ sphæra, circulus, firmamentum.
 فَلَحْمَانٌ، ar. إِزارٌ، tegumentum, velum.
 فَلَحْمَانٌ vel فَلَحْمَانٌ cingulum, zona circa lumbos
 فَلَحْمَانٌ Aph. verbi فَلَحْمَانٌ .
 فَلَحْمَانٌ، fut. فَلَحْمَانٌ، inf. فَلَحْمَانٌ، cepit, apprehendit, excepit, occupavit, detinuit; secutus est;

clausit, cohibuit ; continuit ; duravit. اَنْتَ حَارِبٌ apprehendit manum ejus : auxiliatus est ei ; اَنْتَ حَسْرَةٌ apprehendit terga ejus : opem ei tulit ; اَنْتَ دَشْنَةً servavit vitam alicui ; اَنْتَ مُّنْهَمْنَةً prohibuit a, dissuasit ; اَنْتَ حَارِبٌ tuitus est aliquem ; اَنْتَ قَدْمَةً detinuit faciem suam super : sibi præstituit ; اَنْتَ اَفْكَارًا iram suscepit : iratus est ; occupavit oculum : fascinavit. Ethpe. اَنْتَ لِي pro اَنْتَ passiv. Pa. اَنْتَ prehendere fecit, possidendum dedit. اَنْتَ وَحْدَهُ rem ei commisit.

Aph. اَنْتَ prehendere, tenere fecit ; inclusit. اَنْتَ تَوْهِ accendit ignem, اَنْتَ دَرْدَرَهُ locavit ei domum.

Ettaph. اَنْتَ لِي passiv.

اسْمَا continens, vas, crater.

اَنْتَ vel اَنْتَ claustrum, janua ; præda, captura ; sera.

انْتَ vis, potestas, majestas ;

possessio, provincia, ditio, terræ tractus, horizon.

اَنْتَ مُؤْمِنٌ vel اَنْتَ مُؤْمِنٌ , apprehensio, comprehensio.

اَنْجَمِيزْ , pl. اَنْجَمِيزْ ænigma.

اَنْجَمِيزْ prehendens, tenens, claudens, memor, possidens, dominans, rector ; satelles. مُهَمْنَةً medicina constringens ;

كَنْتَ مُلْأَةً synthetica vocabulum syntheticum, collectivum.

اَنْجَمِيزْ وَمَكْتَبَةً tenens claves : Patriarcha.

اَنْجَمِيزْ Part. Peil contentus, clausus ; tenens, claudens ; princeps. اَنْجَمِيزْ سُمْنَةً incantator serpentis ; اَنْجَمِيزْ كَمْلَةً omnia tenens : Deus ; اَنْجَمِيزْ مُخْتَارًا continens finem, i. e. quidquid finitum, est : ens infinitum ; اَنْجَمِيزْ فَزْوَفَةً tenens locum personæ : vicarius ; اَنْجَمِيزْ وَسْعَدَةً clausa vulvâ : sterilis ; اَنْجَمِيزْ كَهْ كَاهْ مُنْهَمْنَةً sollicite illum honorans.

اَنْجَمِيزْ comprehensio, occupatio, possessio, occlusio.

اَنْجَمِيزْ id.

خَمْ مَهْمَسْ اَمْبَارًا inclusus. مَهْمَسْ ansa, manubrium.

اَنْجَمِيزْ , pl. اَنْجَمِيزْ part. f. - it. pala annuli, fibula, torques, corona.

- inflammatio. *Ethpa.* اَسْتَلِي passiv.; — trop. analogus, similis fuit.
- qui *vel* quod prehendi potest. اَسْتَلِي rebellis, non subactus.
- apprehensio. اَسْتَلِي suspicio, sententia praejudicata.
- irresistibiliter. اَسْتَلِي et اَسْتَلِي incendium, flamma, res inflammabilis.
- vel* اَسْتَلِي, pro اَسْتَلِي, saccus, pera, sinus indusii; it. fulcimentum rei vectæ, trabs, pons.
- ام, اَسْتَلِي; pl. اَسْتَلِي frater, sodalis, similis; c. suff. *nt* اَسْتَلِي. اَسْتَلِي, اَسْتَلِي, اَسْتَلِي diminut.
- pro اَسْتَلِي, pl. اَسْتَلِي soror.
- fraternitas; fratres.
- ام id.
- ام *vel* اَسْتَلِي verb. denom., fraterne se habuit, frater factus est.
- propinquus, affinis. اَسْتَلِي, اَسْتَلِي, اَسْتَلِي.
- cognata. اَسْتَلِي, pl. اَسْتَلِي cognata.
- Pa.* اَسْتَلِي verb. denom., cognitio nem seu affinitatem contraxit, jure affinitatis vindicavit; congruit.
- Ethpa.* اَسْتَلِي passiv.; — trop. analogus, similis fuit.
- اَسْتَلِي, pl. اَسْتَلِي cognatio, affinitas.
- اَسْتَلِي, f. اَسْتَلِي, pl. اَسْتَلِي i. q. اَسْتَلِي fraterne.
- ام cognatus.
- ام cognatio.
- ام, vide اَسْتَلِي.
- ام *vel* اَسْتَلِي, اَسْتَلِي aleali.
- ام — *Aph.* اَسْتَلِي distulit, moratus est, cunctatus est, supersedere fecit, in dies protractit. اَسْتَلِي vino indulxit.
- Ettaph.* اَسْتَلِي passiv.
- Schaph.* اَسْتَلِي, distulit, retardavit; moratus est, cunctatus est.
- Eschtaph.* اَسْتَلِي pass. it. moratus est, cunctatus est, superfuit.
- ام, اَسْتَلِي, اَسْتَلِي, f. اَسْتَلِي; pl. اَسْتَلِي, f. اَسْتَلِي posterior, postremus, novissimus, ultimus; اَسْتَلِي ex extremo: aliqua pars, particula.
- ام *vel* اَسْتَلِي. اَسْتَلِي verb. denom., relictus est, superfuit.
- ام, dicitur de omni re

que posterior fit, *vel* decrescit.

إِسْتَمَدٌ *vel* إِسْتَمَدٌ، *إِسْتَمَدٌ* postremo.

إِسْتَمَدًا *extrema rei, posterioritas.*

إِسْتَنْدًا *vel* إِسْتَنْدًا, *f.*

إِسْتَنْدًا; *pl.* إِسْتَنْدًا, *f.*

إِسْتَنْدًا, *إِسْتَنْدًا* *alius, alter,*

diversus; سَبَّا . . .

primum . . . ac deinde, مَكْثُورًا

mox, إِسْتَنْدًا *dein.*

إِسْتَنْدًا *vel* إِسْتَنْدًا *aliter, e contra.*

إِسْتَنْدًا, *pl.* إِسْتَنْدًا, *f.*

إِسْتَنْدًا, *إِسْتَنْدًا*, *pl.* إِسْتَنْدًا *alius, diversus.*

إِسْتَنْدًا مَخْفِيًا *aequivoca.*

إِسْتَنْدًا *diversitas.*

إِسْتَنَا, *st. c.* لَنْ, *pl.* إِسْتَنَا *extre-*

mitas, finis, exitus, reliquum,

mors, vita futura; حَسْنًا

denique, حَسْنًا *id.*

مَدْحَوْنًا *mora, cunctatio.*

مَدْحَوْنًا *lentus, segnis.*

مَدْحَوْنًا *tarde, lente.*

مَدْحَوْنًا *vel* مَدْحَوْنًا *مَدْحَوْنًا*,

مَدْحَوْنًا *mora, tarditas.*

مَدْحَوْنًا, *it.* مَدْحَوْنًا *id.*

مَدْحَوْنًا *id.* مَدْحَوْنًا *diu.*

مَدْحَوْنًا, *pl.* مَدْحَوْنًا *mora,*

cunctatio.

إِسْتَنْدًا et إِسْتَنْدًا *rhamnus.*

أَنْفُهُ, *pl.* أَنْفُهُ أَنْفُهُ *ἄτομος individualum, corpus, persona, substantia.*

أَنْفُهُ *individualitas, personalitas.*

أَنْفُهُ *individualis, personalis.*

أَنْفُهُ أَنْفُهُ *latera aequalia.*

أَنْفُهُ أَنْفُهُ *solidus, non cavus, arcte clausus, durus, densus.*

أَنْفُهُ أَنْفُهُ *nomen substantivum.*

أَنْفُهُ أَنْفُهُ *summatim.*

أَنْفُهُ أَنْفُهُ *soliditas, densitas, summarium.*

أَنْفُهُ أَنْفُهُ *litura.*

أَنْفُهُ أَنْفُهُ *اطلس أَنْفُهُ rasus.*

أَنْفُهُ *vel* أَنْفُهُ, *vide* أَنْفُهُ.

أَنْفُهُ *vide* أَنْفُهُ.

أَنْفُهُ أَنْفُهُ *pers., تُرْنِج*, aurantium, malum citreum.

أَنْفُهُ أَنْفُهُ *vel* أَنْفُهُ أَنْفُهُ *melissa, citrago.*

أَنْفُهُ أَنْفُهُ *، vide* أَنْفُهُ.

أَنْفُهُ أَنْفُهُ *f. vocis* - أَنْفُهُ, *v.* أَنْفُهُ.

أَنْفُهُ أَنْفُهُ *eu, euge.*

أَنْفُهُ أَنْفُهُ *legatus, nuntius.*

أَنْفُهُ أَنْفُهُ *pl.* أَنْفُهُ أَنْفُهُ *legatio.*

أَنْفُهُ أَنْفُهُ *εἴτα, tunc, postea, ita.*

أَمْ sicut, secundum, circiter.
أَمْ qualis.
أَمْ talia.
أَمْ sicut, prout, pariter ac,
 ac si. — *causat.* ut, quod.
وَهُوَ quasi, instar ejus qui.
وَهُوَ secundum id quod.
أَمْ وَهُوَ *id.*
أَمْ quemadmodum, sicut.
وَهُوَ sicut illud, ejusmodi.
وَهُوَ tales.
وَهُوَ quales, qui.
حَفْتَهُ لَا وَهُوَ talibus exem-
 plis.
وَهُوَ تَلِيْسْ talis, hujus-
 modi.
وَهُوَ أَرْبَابْ qualibus,
i. e. quibus artibus.
وَهُوَ تَنْتَسْ tantus.
وَهُوَ حَفْدَهُ exempli gratia.
وَهُوَ حَفْدَهُ plerumque.
أَمْ وَهُوَ حَدَّهُ e contra.
أَمْ وَهُوَ حَدَّهُ ut ita dicam.
حَفْتَهُ لَا وَهُوَ hujusmodi.
وَهُوَ أَسْنَا وَلَا quasi non.
أَمْ quatenus.
أَمْ *vel*, *contr. ex*
أَمْ et **هُوَ**; quasi, sicut is qui,
 quippe qui, juxta ac si, quo.
أَمْ ubi, ubinam.
أَمْ, *contr. ex* **أَمْ** *et* **هُوَ**,
 ubi est?

هُوَ أَمْ *unde, vel* **هُوَ أَمْ** unde, *vel* **هُوَ أَمْ** quorsum, cur.
حَبْتَهُ لَا أَمْ *vel* **لَا أَمْ** quousque, eatenus.
فَلَا أَمْ ubicumque, quocumque loco.
أَمْ ubi.
لَا أَمْ quo.
هُوَ أَمْ undecumque.
أَهْدَ أَمْ . . . **أَهْدَ أَمْ** alii quidem . . . alii vero.
أَهْدَ أَمْ . . . **أَهْدَ أَمْ** nunc . . . nunc.
وَهُوَ, ubi, ubinam.
أَمْ, *ex* **هُوَ et** **هُوَ**. **لِهِ** ; **أَمْ** quomodo, cur, quare; *sequente* , quomodo, quemadmodum, sicut, ut, ita ut.
أَمْ *vel* **أَمْ** quomodo, qualis, quale.
وَهُوَ quomodocumque.
فَلَا أَمْ *id.*
أَمْ *لَا أَمْ* ut ne, ne.
أَمْ *لَا أَمْ* . . . **هُوَ إِذْ** sicut . . . ita etiam.
أَمْ qualiter.
أَمْ qualitas, forma, status rei, modus.
أَمْ specificus, qualis; id quod ad **أَمْ** pertinet.
أَمْ, *confl. ex* **أَلِيْسْ**, **هُوَ et** **هُوَ**; *unde, undenam? confer.* **هُوَ هُوَ**.

أَحْمَدٌ sicut, semper c. suff.

أَحْمَدٌ similis.

أَحْمَدُونِي, st. c. أَحْمَدٌ quemadmodum,
sicut.

أَحْمَدٌ vel أَحْمَدٌ vel
أَحْمَدٌ, una, simul.

أَحْمَدٌ أَحْمَدٌ una, simul.

أَحْمَدٌ aliquando scribitur
أَحْمَدٌ quemadmodum,
sicut, quo magis; seq. in
posteriori membro مَكْمَنٌ : eo
magis.

أَحْمَدٌ donec, dum, quamdiu.
أَحْمَدٌ أَتْرَى interdum.

أَحْمَدٌ, tonus, modulatio.

أَحْمَدٌ, vide أَدْفَعٌ.

אֵל שָׁדֵי אַמְּגַבֵּם, Deus; אֵל אַמְּלָא,
Deus omnipotens.

אֵיל אַמְּלָא, cervus; f. أَحْمَدٌ, pl.
أَمْكَنَةٌ cerva.

أَمْلָא auxilium, auxiliator.

أَمْكَنَةٌ vel أَمْكَنَةٌ m., nomen
mensis Septembri fere respon-
pondentis.

أَمْكَنَةٌ pron., illi; vide أَسْتَ.

أَمْكَنَةٌ أَمْكَنَةٌ m.; pl. أَمْكَنَةٌ.

أَمْكَنَةٌ وَقَاتٌ أَمْكَنَةٌ arbor.

أَمْكَنَةٌ وَمُسْمَسٌ أَمْكَنَةٌ pistacia, lentiscus,

أَمْكَنَةٌ وَمَادَهَ حَدَّا أَمْكَنَةٌ balsamus,

arbor cujus fructus comedunt
possunt, أَمْكَنَةٌ وَمَادَهَ حَدَّا arbor

umbrosa, أَمْكَنَةٌ مَبْرَمٌ tamaris.

أَمْكَنَةٌ arboreus.

أَمْكَنَةٌ, st. c. أَمْكَنَةٌ; pl.

أَمْكَنَةٌ ramus, arbuseula,
lotus; it. quævis arbor præ-
sertim crassior.

أَمْكَنَةٌ c. deriv. v. أَمْكَنَةٌ :

أَمْكَنَةٌ, vide sub أَمْكَنَةٌ.

أَمْكَنَةٌ, vide أَمْكَنَةٌ.

أَمْكَنَةٌ part. affirm. ita, sane,
etiam; restrict. sed, vero, au-
tem, si; unq. imo, imo vero,
num.

أَمْكَنَةٌ, f. أَبْنَاءٌ, ex partic. inter-
rog. insepar. أَمْكَنَةٌ et pron. inus.

أَمْكَنَةٌ f. وَلَا, pl. أَمْكَنَةٌ; pl. c.

quis, quæ, quid? quisnam,
qualis, c. vel s. interr.;

أَمْكَنَةٌ ille qui, أَمْكَنَةٌ ecquis?

أَمْكَنَةٌ quisnam, quis, qui?

أَمْكَنَةٌ كُلُّ quicumque.

وَوَأَمْكَنَةٌ أَمْكَنَةٌ qualis.

أَمْكَنَةٌ pl. أَمْكَنَةٌ; pl. أَمْكَنَةٌ أَمْكَنَةٌ ;

pl. أَمْكَنَةٌ species, qua litas,

ratio.

Ethpaal أَمْكَنَةٌ verb. denom.
prædictus est qualitate aliqua,
modum vel speciem alterius
assumit.

أَمْكَنَةٌ qualitatem exprimen-

نَمَّا مَفَاعِنَأَمْكَنَةٌ nomen qualificati-

vum, i. e. adjectivum; أَمْتَنْ sine qualitate: simplex, merus.

أَمْتَنْ vel أَمْتَنْ elsayagyrī, logica.

أَمْتَنْ vel أَمْتَنْ iāspīz, jaspis.

أَمْلَ vel أَمْلَ elnī, frustra, temere, immerito.

أَمْلَ m., nomen mensis Maii fere respondentis.

أَمْلَ, vide أَمْلَ.

أَمْلَ, f. أَمْلَ lebes, cacabus, lagena.

أَمْلَ vel أَمْلَ oxydatum eupri vel ferri.

أَمْلَ f., iāris vel iōris, iris florentina.

أَمْلَ verb. subst. est; flectitur per personas, additis suffixis:

أَمْلَ ego sum, أَمْلَ tu es, m., أَمْلَ tu es, f., أَمْلَ illē

est, أَمْلَ illa est, أَمْلَ nos sumus, c., أَمْلَ vos estis, m., أَمْلَ vos estis, f., أَمْلَ illi sunt, أَمْلَ

illae sunt. — Ad præteritum efformandum subjungitur verbum أَمْلَ, e. g. أَمْلَ دَلَ fuit,

erat, أَمْلَ دَلَ vel أَمْلَ أَمْلَ fuerunt, erant. دَلَ دَلَ دَلَ

res quæcumque. أَمْلَ est apud nos, sunt apud nos: habemus.

أَمْلَ, contractum ex أَمْلَ et أَمْلَ, non est, non sunt; flectitur sicut أَمْلَ, e. g. أَمْلَ non sum, أَمْلَ non est, أَمْلَ non sunt; et ita porro.

أَمْلَ, كَبِيرٌ, tui, ejus est; in tua, in sua potestate est ut.

أَمْلَ ei incumbit, tenetur. أَمْلَ non ego: actum est de me, أَمْلَ non est qui, non est quod, non licet.

أَمْلَ essentia, existentia, esse, substantia.

أَمْلَ essentialiter.

أَمْلَ essentialis, etc.

أَمْلَ existens, ens, ens supremum, principium, substantia.

أَمْلَ ens tenebrarum: diabolus.

أَمْلَ substantialiter, realiter, semper.

أَمْلَ substantialis, realis.

أَمْلَ, unde Pa. أَمْلَ durum, callosum fecit.

أَمْلَ callosus factus est.

أَمْلَ callositas.

أَمْلَ, pl. أَمْلَ ἔχιδνα, viper.

أَمْلَ rel. أَمْلَ, f. أَمْلَ gallus, gallina.

اَقْتَفِنْتُهُ et اَقْتَفِنْتُهُ sollicite.

اَمْحَفَرٌ vel اَمْحَفَرٌ , اَمْحَفَرٌ sella equi, clitellæ.

اَصْنَعَ - Pa. اَصْنَعَ aravit, seminavit, coluit.

Ethpa. اَصْنَاعَ pass.

اَصْنَاعَ arator, seminator.

اَرْجُونَ agricultura, terra bene culta, messis; *inde* rusticitas.

اَرْجَدَ pl. اَرْجَدَ iracundia.

اَرْجَدَ iracundus.

اَرْجَدَ iracundia.

اَرْجَدَ tristitia, angustiæ.

اَرْجَمَ verb. denom. iratus est in, excanduit.

اَلْيَارُ ex اِنْ et اِنْ , si non, nisi, sed, imò, quamvis.

اِنْ اِنْ nisi, اِنْ nisi ut.

اِنْ اِنْ sed tantum quòd.

اِنْ sin minus, alioquin.

اِنْ . . . اِنْ quin : اَسْ تَعْصِمُ اِنْ sibi temperare non potuit quin ingredetur.

اَنْ اِنْ . . . اَنْ non solum . . . sed etiam.

اِنْ , fut. اِنْ ejulavit, lamentatus est, luxit, deploravit ; it. se fatigavit, *sed tunc melius* scrib. اَنْ ; cfr. اَنْ .

Ethpe. اَنْا كَ deploratus est.

Pa. اَنْكَ multum luxit ; it. ut

Aph. verbi اَنْ , fatigavit.

اَنْكَدَهُ , pl. اَنْكَدَهُ lamentatio.

اَنْكَدَهُ , f. اَنْكَدَهُ lugens, præfica.

اَنْكَدَهُ , f. اَنْكَدَهُ ; pl. f. اَنْكَدَهُ

lugens, lamentans ; ululans,

inde cacodæmon ; — lamentatrices.

اَنْكَدَهُ , اَنْكَدَهُ ploratus, ululatus.

اَنْكَدَهُ vel اَنْكَدَهُ ovis vel bovis

cauda pinguis ; it. lamia, *sed melius* legitur اَنْكَدَهُ , طَرِيلَةٌ ,

اَنْكَدَهُ , اَنْكَدَهُ Deus ; c. aff.

اَنْكَدَهُ Deus meus, اَنْكَدَهُ Deus tuus, اَنْكَدَهُ , اَنْكَدَهُ , اَنْكَدَهُ etc.

اَنْكَدَهُ , اَنْكَدَهُ pl. dii ; c. aff.

اَنْكَدَهُ dii mei, اَنْكَدَهُ dii eorum etc.

اَنْكَدَهُ f. , pl. اَنْكَدَهُ dea.

اَنْكَدَهُ verb. denom. deificavit.

اَنْكَدَهُ pass.

اَنْكَدَهُ et اَنْكَدَهُ divine.

اَنْكَدَهُ dimin. idolum.

اَنْكَدَهُ divinitas, collect. dii.

اَنْكَدَهُ atheismus.

اَنْكَدَهُ divinus, supernaturalis, theologicus, theologus, metaphysicus. مُحَمَّدَهُ اَنْكَدَهُ Theologia. مُشَكَّهُ اَنْكَدَهُ ovi albumen.

اَنْكَدَهُ deificatio, actio deificandi.

اَكْهَمْ مُهَادِكْهَمَةً participatio divinæ naturæ.

اَكْهَمْ , ex اَنْ et اَنْ = ar. نَزَّ , hebr. اَنْ , ex اَنْ et اَنْ , si, quod si, num, utinam. اَكْهَمْ اَنْ , ar. تَوْلَى , si non, nisi.

اَكْهَمْ vel اَكْهَمْ , colostrum. اَكْهَمْ اَنْ et اَكْهَمْ اَنْ اَلْهَمْ اَلْهَمْ , aloe.

اَكْهَمْ اَكْهَمْ مُهَادِكْهَمَةً = اَنْ اَنْ . Deus verus.

اَكْهَمْ اَكْهَمْ اَلْهَمْ اَلْهَمْ , mare, sal. اَكْهَمْ , vide اَكْهَمْ .

اَكْهَمْ اَكْهَمْ fumus.

اَكْهَمْ , fut. اَكْهَمْ stultus, ignorans fuit, infirmatus est ; cfr. اَنْ et اَكْهَمْ Aph. v. اَنْ .

Ethpe. اَكْهَمْ اَنْ stultitiam, ignorantiam, infirmitatem simulavit.

اَكْهَمْ اَكْهَمْ , f. ; pl. اَكْهَمْ اَكْهَمْ , f. اَكْهَمْ stultus, ignorans, infirmus, ægrotus, levis, impudens, contemptus ; subst. dux viæ ; it. impostor ; inf. corrupta fides : hæresis ; it. rerum turpium auctrix.

اَكْهَمْ اَكْهَمْ debilitas, infirmitas ; trop. humilitas.

اَكْهَمْ اَكْهَمْ fut. اَكْهَمْ iratus est, iram servavit.

اَكْهَمْ اَكْهَمْ malevolus, indignabundus.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ iracundia, indignatio, furor; stultitia.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ nux avellana.

اَكْهَمْ اَكْهَمْ fut. اَكْهَمْ scaturivit.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ effusio, inundatio ; it., costa, latus ; ar. ضَلَعْ , trop. uxor.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ latera habens ; اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ figura lateralis.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ f. ; pl. اَكْهَمْ اَكْهَمْ navis.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ nauta, nauticus, nauclerus.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ , pl. اَكْهَمْ اَكْهَمْ navicularia.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ nauta, nauclerus.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ et اَكْهَمْ اَكْهَمْ ars nau-

ticalia.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ prima littera alphabeti. اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ vel اَكْهَمْ اَكْهَمْ alphabetum, اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ juxta ordinem alphabeticum.

اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ ; pl. اَكْهَمْ اَكْهَمْ اَكْهَمْ mille.

مُكْفَ، vide مُكْفَ.

أَحْرَى، fut. نَاكِمٌ arctavit,
oppressit; ursit, coegit; ob-
sedit, afflixit; contendit; لَعْنٌ
impers. oportuit. it. necessaria
fuit res; مُحْتَاجٌ necessario;
مُحْتَاجٌ necessariae res.

Ethpe. أَنْتَابٌ pass.

Pa. أَخْرَى i. q. Pe.

أَنْجُوْسْتَوْنٌ angustiae, afflictio,
coactio, morbus; locus an-
gustus.

أَكْمَوْنَا persecutor, oppressor;
angustiae.

أَكْبَرْنَا arctus, afflictus, op-
pressus; it. urgens; f. pl.
أَكْتُوبَنَا res necessariæ. أَلْوَنٌ
أَكْبُونَا littera abbreviata; أَكْبُونَا
خُسْمَهْ مُرْفَأً victus cupiditate; خُسْمَهْ
أَكْبُونَا career.

أَكْبُونَهْ angustiae, necessitas,
indigentia, morbus gravis.

أَكْبُونَهْ et أَكْبُونَهْ necessario,
coacte.

أَكْبُونَهْ، أَكْبُونَهْ، f. أَكْبُونَهْ neces-
sarius; أَكْبُونَهْ، f. pl. res
necessariæ. أَكْبُونَهْ أَكْبُونَهْ necessarius essentia: Ens ne-
cessarium.

أَكْبُونَهْ et أَكْبُونَهْ necessitas.

أَصْبَحَ، fut. يَمْلُكُ fugit, evasit.

Pa. مُفْرِطٌ fugit; liberavit; cfr.

مُفْرِطٌ .

أَمْكَنْتَ liberatus.

أَمْكَنْتَهْ fuga, liberatio.

أَمْكَنْتَهْ lacerta.

أَمْكَنْتَهْ oppidulum.

أَمْكَنْتَهْ portulaca herba.

أَمْكَنْتَهْ quasi ex أَمْكَنْتَهْ et أَمْكَنْتَهْ،
pygmæus.

أَمْكَنْتَهْ vel أَمْكَنْتَهْ، et أَمْكَنْتَهْ أَخْبَرْنَا;
pl. أَمْكَنْتَهْ et أَمْكَنْتَهْ pala,
scopæ.

أَمْكَنْتَهْ f. tapetum, toga.

أَمْكَنْتَهْ، أَمْكَنْتَهْ pl. أَمْكَنْتَهْ، raro
أَمْكَنْتَهْ، mater; trop. caput,
origo, fons. أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ mater,
fons mysteriorum: baptisma;
أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ metropolis;
أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ fons aquarum:
piscina, aqueductus; أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ mater
fidelium: Ecclesia; أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ mater
nomine excelsa: Maria Virgo;
أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ origo luminarium:
oriens; أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ vertex ca-
pitis; أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ mater
luxuriae: guttur, gula, con-
cupiscentia; أَمْكَنْتَهْ أَمْكَنْتَهْ mater
nutritionis: hepatis.

أَمْكَنْتَهْ maternus.

أَمْكَنْتَهْ pl. أَمْكَنْتَهْ et أَمْكَنْتَهْ

populus, natio; ratio, methodus, classis.

۱۰۷ مَهْدَىٰ *vel* مَهْدَىٰ *formam matrix*, exemplar; gemma *annuli*, scella camelii ne mordeat.

۱۰۸ مَهْدَىٰ , heb. אַמְדָה , i.e. pars brachii anterior; *pl.*

۱۰۹ مَهْتَرٌ , ulna, cubitus, memb. et mens., brachium.

۱۱۰ مَهْتَرٌ وَمَهْتَرٌ res variae dimensionis; *it.* vide s. ۱۰۸ .

۱۱۱ مَهْنَدٌ et ۱۱۲ مَفْعُولٌ *pro* مَفْعُولٌ , fut. assiduu fuit, perseveravit, perststit; *præter part.* *Peil* مَهْنَدٌ *vix in usu est.*

Ethpe. مَهْنَدٌ *sicut* مَهْنَدٌ . *حَكَمَ* مَهْنَدٌ instituit illi insidiando.

Ethpa. مَهْنَدٌ perseveravit.

Pael مَهْنَدٌ credidit, fidit, concredidit, arte fabricavit.

Ethpaial مَهْنَدٌ creditus est, pro vero habitus est, sibi commissum habuit.

۱۱۳ مَهْنَدٌ مَهْنَدٌ artifex, opifex, peritus.

۱۱۴ مَهْنَدٌ , pl. مَهْنَدَاتٍ , مَهْنَدَاتٍ ars, peritia, artificium.

۱۱۵ مَهْنَدٌ بَشَّةٌ ars logices.

۱۱۶ مَهْنَدٌ حَدَا ars maxima: alchimia.

۱۱۷ مَهْنَدٌ , f. مَهْنَدَةٌ artificialis, efficiens *causa.* *it.* in arte peritus.

۱۱۸ مَهْنَدٌ artificiose, affabre.

۱۱۹ مَهْنَدٌ مَهْنَدٌ perseverans, constans, assiduus.

۱۲۰ مَهْنَدٌ perpetuo, continuo, constanter, fideliter, omnino.

۱۲۱ مَهْنَدٌ adv. vere, certe, fideliter, constanter; *it.* formula assentiendi, amen; *heb.* נְאָזָן, אָזָן.

۱۲۲ مَهْنَدٌ وَمَهْنَدٌ cum consensu alicuius.

۱۲۳ مَهْنَدٌ constantia, perseverantia. مَهْنَدَةٌ مَهْنَدَةٌ constanter, assidue; مَهْنَدَةٌ مَهْنَدَةٌ continuo per duos annos.

۱۲۴ مَهْنَدٌ firmitas, fidelitas, fides data, securitas; veritas, fiducia, sinceritas; fides: *virtus et doctrina;* symbolum fidei. *Inde,* per abbrev. formula jurandi: مَهْنَدٌ مَهْنَدٌ per fidem.

۱۲۵ مَهْنَدٌ مَهْنَدٌ part. act. credens Deo, fidem habens, fidelis, christianus, f. مَهْنَدَةٌ مَهْنَدَةٌ fidelis.

۱۲۶ مَهْنَدٌ مَهْنَدٌ part. pass. creditus, tutus, constans, perpetuus; *trop.* eunuchus, oeconomicus.

۱۲۷ مَهْنَدٌ مَهْنَدٌ fideliter.

ج مَحْدُودٌ vel مَحْمِدٌ credibilis; مَحْمِدٌ credibilitas, fidelitas.

ج مَحْمِدٌ, pl. مَحْمَدٌ natura, species, gradus, ars, methodus; opus, factum, officium, status, vitæ ratio; mons, flumen; it. in plur. Emaeorum gens, unde aborigenæ, gigantes, proceres, incolæ.

ج مَحْمَدٌ id. q. مَحْمَدٌ.

ج مَحْمِدٌ rivus, stagnum; pecten ferreum pro lino pectendo, pala ferrea.

ج مَحْمِدٌ id. — it. cf. حَمَدًا.

ج مَحْمِدٌ ئِبْرَوْبَعْ, gypsi species. ج مَحْمِدٌ cibus carne cruda cum aceto constans. cfr. heb. חַמְדָה, ar. حَامِدٌ; cfr. etiam حَمْدُوا. ج مَحْمِدٌ lacerta.

ج مَحْمِدٌ, fut. مَهْمَدٌ dixit, affirmavit, nuncupavit, narravit, recitavit; مَهْمَدٌ مُّهْمَدٌ memoriter recitavit, مَهْمَدٌ مُّهْمَدٌ تَفْعَلَ dixit proprio motu; مَهْمَدٌ مُّهْمَدٌ dixit de; مَهْمَدٌ مُّهْمَدٌ nimirum; مَهْمَدٌ مُّهْمَدٌ causam dixit pro, defendit.

Ethpe. مَهْمَدٌ vel مَهْمَدٌ pass.

ج مَهْمَدٌ, f. مَهْمَدٌ fama est, dicitur, fertur.

ج مَهْمَدٌ locutor, orator, cantor.; operam dans alicui rei; scriptor.

ج مَهْمَدٌ sermo, oratio.

ج مَهْمَدٌ, pl. مَهْمَدٌ dux, imperator, praefectus; أمير emirus. pl. pers. مَهْمَدٌ

ج مَهْمَدٌ ars oratoria, eloquentia, dictio; praefectura, emiratus. مَهْمَدٌ m; pl. مَهْمَدٌ sermo, oratio, tractatus, liber, propositio; carmen vi-delicet, حَمَادَةٌ حَمَادَةٌ ut uno verbo dicam, مَهْمَدٌ summatis.

ج مَهْمَدٌ dictus, dicibilis.

ج مَهْمَدٌ dicta, sermones.

ج مَهْمَدٌ مُّهْمَدٌ ineffabiliter.

ج مَهْمَدٌ Aph. v. مَهْمَدٌ.

ج مَهْمَدٌ, pl. مَهْمَدٌ; f. مَهْمَدٌ, ovis, agnus, agna. cfr. حَمَادَةٌ, hebr. אַמְרָה, lana.

ج مَهْمَدٌ مُّهْمَدٌ ag-nellus; f. مَهْمَدٌ, pl. مَهْمَدٌ, agnella.

ج مَهْمَدٌ, ar. أَمَةٌ, c. suff. مَهْمَدٌ, مَهْمَدٌ, etc.; pl. مَهْمَدٌ, ancilla, serva, a radicali مَهْمَدٌ, hebr. אַמְרָה; it. in alio sensu v. مَهْمَدٌ.

ج مَهْمَدٌ officium vel conditio servilis, servitus.

أَمْهَدًا , pl. أَمْهَاداً id. — it. vide
أَمْهَدًا .

أَمْهَدًا i. q. أَمْهَدًا .

أَصْلَمٌ quando.

جِهَّا نَاهِدَمْ quousque.

كُلَّا نَاهِدَمْ quotiescumque.

نَاهِدَمْ فِي نَاهِدَمْ cum vel sine ?, a quo
tempore.

وَنِي نَاهِدَمْ quocumque tempore.

كُلُّ وَنِي نَاهِدَمْ utinam !

نَاهِدَمْ بَعْدَهُ interdum.

نَاهِدَمْ ... نَاهِدَمْ ... نَاهِدَمْ ...
nunc ... nunc, modo ... modo.

أَسْلَمٌ si, an, num, ö; nnq. expletive
ponitur.

وَنِي , sicut .

إِنْ إِنْ vel contracte إِنْ si non,
nisi.

وَنِي إِنْ si vero, sin autem.

إِنْ ... إِنْ sive ... sive.

إِنْ ... إِنْ vel إِنْ وَنِي ... إِنْ id.

كُلُّ إِنْ vel كُلُّ بَعْدَهُ si vero, sin autem.

أَنَا ego, pl. سَنَّا nos; cum punc-
to inferno insignitur, habet
vim verbi subst. sum; sed
tunc primum l nec vocalem
habet, nec enunciatur. إِنْ إِنْ
ego sum, إِنْ إِنْ volo.
*Haec pronomina in unam vo-
cem coalescere valent cum*

*precedenti dictione ; مُهْكَنَا ,
pro لِي لِي مُهْكَنَا occido; مُهْكَنَا ,
pro كُنْتَا إِنْ إِنْ , voco; مُبَهْمَسْ إِنْ إِنْ sanctus sum.
وَنِي إِنْ إِنْ ego sum; cfr.
وَنِي , بَهْنَ .*

أَنْ Aph. v. بَهْنَ .

أَنْ , v. s. وَنِي .

أَنْهَمَنَا , v. أَنْهَمَنَا .

أَنْهَمَنَا θρυώνα, annonā, tribu-
tum; pl. أَنْهَمَنَا ; it. impensa,
commeatus, stipendum.

أَنْسَى fut. تَائِسَ gemuit.

Ethpa. تَائِسَ , pro تَائِسَ , in-
gemuit.

Ettaph. تَائِسَ , pro تَائِسَ , id.

أَنْسَدَا et أَنْسَدَا , c. suff. سَدَهْ ;
pl. إِنْشَدَا et إِنْشَدَا , gemitus,
suspiria.

أَنْسَدَا , pl. إِنْشَدَا id.
أَنْسَدَا , pro إِنْشَدَا , gemebundus, f.
أَنْسَدَا .

أَنْسَدَا ut أَنْسَدَا .

أَنْخَرَا , cfr. heb. נַחַר. stannum.

أَنْ verb. denom. fut. مُهْكَنَا stannum illovit; أَنْهَسْ stannatus.

Ethpe. أَنْلَى vel أَنْلَى stannatus
est.

أَنْخَرَا stanneus.
أَنْخَرَا εγγείον, linteum ad

abstergendum; *pl.* أَبْحَثُ .

أَبْحَثُ, fut. أَبْحَثَ ar. آن, gemuit, clamavit, questus est.

أَمْوَالٌ, *pl.* أَمْوَالٌ tristitia, luctus, sollicitudo, cura.

أَسْتَأْسِي multum gemens.

أَسْتَهْدِي gemitus.

أَسْتَهْدِي ignavia, socordia.

أَسْتَهْدِي, v. ٥٦.

أَسْتَهْدِي et أَسْتَهْدِي, أَسْتَهْدِي, ḥavz̄oż̄, f., oblatio, liturgia, missa, orationes missae, velum calicem tegens; *pl.* أَسْتَهْدِي et أَسْتَهْدِي أَسْتَهْدِي et أَسْتَهْدِي أَسْتَهْدِي necessitas; *pl.* أَسْتَهْدِي, أَسْتَهْدِي, أَسْتَهْدِي, أَسْتَهْدِي ; أَسْتَهْدِي necessitas absoluta.

أَسْتَهْدِي necessarius.

أَسْتَهْدِي necessitas.

أَسْتَهْدِي ḥavz̄yak̄iōn, latrina.

أَسْتَهْدِي necessario.

أَرْجَعَ, fut. أَرْجَعَ coegit.

Ethpe. أَرْجَعَ coactus est; it. أَرْجَعَ tristatus est, tæduit illum.

أَرْجَعَ, it. أَرْجَعَ, forma græca pro iinusit. syr. أَرْجَعَ usurpat., *pl.* أَرْجَعَ, angustiæ, angor, auxetas.

أَرْجَعَ, أَرْجَعَ non invenitur in sing., sed cfr. اتف et هـ; *pl.* أَرْجَعَ, أَرْجَعَ, stat. const. أَرْجَعَ; cum affix. أَرْجَعَ هـ etc. facies, vultus, forma seu species externa. أَرْجَعَ هـ velum.

أَرْجَافَا in facie i. e. publice, vel etiam simulate, nempe ad faciem tantum.

أَرْجَفَ in facie i. e. in conspectu alicujus; eadem locutio adhibetur cum verbo هـ jurare fecit: هـ دَافَتْ هـ دَافَتْ هـ jurare illos fecit in conspectu pueri, i. e. jurejuringando obstrinxit eos puer.

أَرْجَتْ versus.

أَرْجَعَ pro, propter, super, in fronte.

أَرْجَعَ panis propositionis.

أَرْجَعَ hebr. אֲנֵגֶת, species quædam avis.

أَرْجَعَ Aph. verbi سـ .

أَرْجَعَ, fut. أَرْجَعَ, ingemuit, suspiravit; cfr. أَسْ .

Ethpa. أَرْجَعَ id. ac Pe.

أَرْجَعَ gemitus, dolor, tormentum.

أَرْجَعَ أَرْجَعَ multum gemens.

أَرْجَعَ, f. ἀγκυρα, anchora.

لُفْتَه ; pl. **لِفْتَه** , **لُفْتَه** ; pl. **لِفْتَه** et **لِفْتَه** ; constr. **لِفْتَه** homo ; collect. homines, mortales ; per extens. : familia, parentes, cognati, cives. f. pl. **لُفْتَه** , vide **لِيَدَاهَا** ; cfr. ar. **إِنْسَانٌ** . homo, homines.

لِيَنْدَه aliquis, quidam, etiam in fem. **لِيَنْدَه** mulier quædam. **لِيَنْدَه** vel **لِيَنْدَه** nemo. **لِيَنْدَه** unusquisque. **لِيَنْدَه** unusquisque, qui libet.

لِيَنْمَه humanitas, genus huma-
num, cives, domestici, paren-
tes.

لِيَنْمَه homunculus.

لِيَنْتَه humanus.

لِيَنْتَه humane.

لِيَنْمَه i. q. **لِيَنْمَه** .

لِيَدَه tu, pl. **لِيَدَه** vos ; fem. **لِيَدَه** , pl. **لِيَدَه** . ubi habet vim verbi subst. sum cum præced. dict. coalescit in unum v. g. **لِيَدَه** , ex **لِيَدَه** **لِيَدَه** tu occidis; **لِيَدَه** , ex **لِيَدَه** **لِيَدَه** tu sanctus es, f. **لِيَدَه** ; **لِيَدَه** ex **لِيَدَه** **لِيَدَه** tu mundus es, f. **لِيَدَه** etc., pl. **لِيَدَه** **لِيَدَه** etc. **لِيَدَه** **لِيَدَه** etc. **لِيَدَه** , st. c. **لِيَدَه** ar. **إِنْسَانٌ** , **أَنْثَى** ;

pl. **لِفْتَه** , mulier, uxor.
لِيَدَه dim. muliercula.
لِفْتَه muliebris.

لِيَهْلَهْلَه - Pa. **لِيَهْلَهْلَه** , fut. sanavit, curavit; trop. restauravit.

Ethpa. لِيَهْلَهْلَه pass; insuper se sanavit.

لِيَهْلَهْلَه remedium.
لِيَهْلَهْلَه part. præs.-it. subst., pl. **لِيَهْلَهْلَه** , **لِيَهْلَهْلَه** medens, medicus; f. **لِيَهْلَهْلَه** , **لِيَهْلَهْلَه** , **لِيَهْلَهْلَه** ; pl. **لِيَهْلَهْلَه** , **لِيَهْلَهْلَه** , **لِيَهْلَهْلَه** sanatio, medicina, sanitas, remedium.

لِيَهْلَهْلَه medicinalis.
لِيَهْلَهْلَه sanans, pl. **لِيَهْلَهْلَه** medici.

لِيَهْلَهْلَه et **لِيَهْلَهْلَه** sanatio.
لِيَهْلَهْلَه qui sanatur, sanabilis.

لِيَهْلَهْلَه myrtus ; fem. **لِيَهْلَهْلَه** .
لِيَهْلَهْلَه , st. const. **لِيَهْلَهْلَه** ; pl. **لِيَهْلَهْلَه** paries. **لِيَهْلَهْلَه** , pl. **لِيَهْلَهْلَه** fundamentum.
لِيَهْلَهْلَه cervical.

لِيَهْلَهْلَه - Pa. **لِيَهْلَهْلَه** dissipavit bona; seduxit, fecit ut erraret.

Ethpe. لِيَهْلَهْلَه erravit, deviavit, modum excessit.

أَمْهَدْكَمْلَى . أَمْهَدْكَمْلَى . f. أَمْهَدْكَمْلَى , أَمْهَدْكَمْلَى luxuriosus, prodigus ; pl. m.. أَمْهَدْكَمْلَى , pl. f. أَمْهَدْكَمْلَى .
أَمْهَدْكَمْلَى , أَمْهَدْكَمْلَى intemperanter.
أَمْهَدْكَمْلَى , أَمْهَدْكَمْلَى أَمْهَدْكَمْلَى luxuria, intemperantia.

أَمْهَدْكَمْلَى , أَمْهَدْكَمْلَى stabulum.
أَمْهَدْكَمْلَى stabularius, equorum gubernator.
أَمْهَدْكَمْلَى , pl. أَمْهَدْكَمْلَى , أَمْهَدْكَمْلَى stadium.
أَمْهَدْكَمْلَى et أَمْهَدْكَمْلَى στάδιον, c. palestra, hippodromus, stadium; pl. أَمْهَدْكَمْلَى , أَمْهَدْكَمْلَى .
أَمْهَدْكَمْلَى Στοά, porticus; أَمْهَدْكَمْلَى
Στοῖκοι, Stoici.

أَمْهَدْكَمْلَى στύλος, pers. أَنْشُون, ar. أَنْطَرَانَ, columnna, sacellum monachorum.

أَمْهَدْكَمْلَى et أَمْهَدْكَمْلَى stylita.
أَمْهَدْكَمْلَى στοιγέσιον, clementum, rudimentum, principium cuiusve rei, litterae alphabeti; metaph. facultates.

أَمْهَدْكَمْلَى et أَمْهَدْكَمْلَى elemen-

taris.

أَمْهَدْكَمْلَى στόμαχος, stomachus.

أَمْهَدْكَمْلَى ιστοπόδιον, jugum textorium.

أَمْهَدْكَمْلَى vel أَمْهَدْكَمْلَى tempus;

pl. أَمْهَدْكَمْلَى , أَمْهَدْكَمْلَى .
أَمْهَدْكَمْلَى στύραξ, styrax, myrrha, stacte.
أَمْهَدْكَمْلَى satrapæ.
أَمْهَدْكَمْلَى f. στολή, pl. أَمْهَدْكَمْلَى stola, pallium, vestis.
أَمْهَدْكَمْلَى vel أَمْهَدْكَمْلَى chalybs.
أَمْهَدْكَمْلَى στάσις, militia; in accusat. أَمْهَدْكَمْلَى .
أَمْهَدْكَمْلَى vel أَمْهَدْكَمْلَى , pl. أَمْهَدْكَمْلَى perturbator, calumniator.
أَمْهَدْكَمْلَى σταγνή, stacte, styraeis arbor.
أَمْهَدْكَمْلَى vel أَمْهَدْكَمْلَى , stratum, via.
أَمْهَدْكَمْلَى στρατεία, pl. أَمْهَدْكَمْلَى militia; it. sicut
أَمْهَدْكَمْلَى .
أَمْهَدْكَمْلَى στρατηγός, dux militum.
أَمْهَدْكَمْلَى στρατιώτης, miles; pl. أَمْهَدْكَمْلَى vel أَمْهَدْكَمْلَى .
أَمْهَدْكَمْلَى genus scripturæ antiquissimæ apud Syros : سطر انجيلي scriptura Evangelii, vel στρογγύλη rotunda.
أَمْهَدْكَمْلَى στρηγός, luxus, voluptas.
أَمْهَدْكَمْلَى mortarium.
أَمْهَدْكَمْلَى vel أَمْهَدْكَمْلَى , it. أَمْهَدْكَمْلَى σγολή, pl. أَمْهَدْكَمْلَى schola, gymnasium. حَنَّ أَمْهَدْكَمْلَى , pl. أَمْهَدْكَمْلَى حَنَّ discipulus.

اممَّهَكْتَا, pl. امِّمَّهَكْتَا scho-
lasticus, discipulus, *vel etiam*
magister.
اممَّهَفَدَا limen.

اممَّهَفَدَا, امِّمَّهَفَدَا, امِّمَّهَفَدَهَا, امِّمَّهَفَدَهَا συγγραφη, pl. امِّمَّهَفَدَتَنَ امِّمَّهَفَدَهَا etc. species, forma,
decor, honestas, habitus, ra-
tio agendi, causa, professio
monastica. لا حَبَّ مِنْ امِّمَّهَفَدَهَا nullo modo, امِّمَّهَفَدَهَا امِّمَّهَفَدَهَا diversæ species.
امِّمَّهَفَدَهَا hypocrita; it. hones-
tus.

امِّمَّهَفَدَهَا hypocrisis.
امِّمَّهَفَدَهَا figuralis.
امِّمَّهَفَدَهَا verb. denom. formavit,
repræsentavit, simulavit, fin-
xit; mutavit.
امِّمَّهَفَدَهَا simulavit, formam
induit.
امِّمَّهَفَدَهَا, مِمَّهَفَدَهَا forma, figura-
tio.
امِّمَّهَفَدَهَا configuratio.
امِّمَّهَفَدَهَا figurator, fector.
امِّمَّهَفَدَهَا conformatio.

امِّمَّهَفَدَهَا vel امِّل, fut. امِّن, coacer-
vavit, abdidit; subministra-
vit.

Ethpe. امِّل et امِّل pass.
Pa. امِّل coacervavit, obtexit,

occultavit; it. *Aph. verbi* امِّل .
امِّل et امِّل, v. امِّل .
امِّهَنَّا res in usum temporis
futuri repositæ, thesaurus; pl.
امِّهَنَّا commeatus.
امِّهَنَّا coacervatio.

امِّهَفَبَا vel امِّهَفَبَا vas plum-
beum.
امِّهَفَهَّا σπόργυρος, spongia ;
it. lana munda.
امِّهَفَهَّا, pl. امِّهَفَهَّا cursor,
veredarius; cfr. pers. سُبُك, celer, levis.
امِّهَفَهَّهَا spiculator, tortor,
carnifex.

امِّهَفَنَّا et امِّهَفَنَّا σωρόν, cuneus.
امِّهَفَنَّا et امِّهَفَنَّا σφεῖρα, cohors; it. σφεῖρα, sphæra.
امِّهَفَنَّا et امِّهَفَنَّا globosus.
امِّهَفَنَّا et امِّهَفَنَّا globo-
sitas.

امِّهَفَتَنَّا, pl. امِّهَفَتَنَّا σπληγνίον, ligamentum vulne-
ris, medicina, emplastrum.
امِّهَفَنَّا, امِّهَفَنَّا id.
امِّهَفَسَ f. pl. امِّهَفَسَ ḥσπιτ, aspis, viper.
امِّهَفَهَا merees, retributio.

ἀσπάραχγος , asparagus, novum german.

εύδονία ἡμένιον cydoniae; malum cydonium, ar.

οεύμηνον basilicum, jasminum.

κοφίνη σπυρίς, cophinus.

σπαθίζοις, gladio armatus, armiger.

μέλι, v. ملک.

σκυτία σκυτος, scutica, flagellum.

σκέτηνον id.; insuper Σκήτη desertum scetense.

αβσίνθιον marinum.

σκύφος, scyphus.

فَصَنْتَهُ, fut. مَهْمَهْ captivum fecit, vinxit, cinxit, ligavit, junxit, clausit; tropice: vovit, obligatione adstrinxit.

Ethpe. فَهَاهِلِي pass.

λιγάνη ligamentum, vinculum, compedes, vinculis constrictio, obligatio.

λιγάνη ligans, conjunctio copulativa.

λιγάνη vinculis constrictio, obligatio.

λιγάνη, اَسْتَهْ vincetus, cinctus armis. خَدَّ اَهْمَنْ domus captiorum: career.

λιγάνη ligatio, captivitas.

λιγάνη, ligamentum, vinculum, particula copulativa, obligatio voti; Zodiacus.

λιγάνη, مَادِهَهْ ligamentum.

λιγάنη سَرْجَلْ cingulum; per ext. lumbi.

λιγάنη, pl. مَادِهَهْ fasciculus, turba hominum, animantium.

λιγάنη pro اَلِهَهْ, v. معن.

λιγάنη اَسْسَارِيُونْ assarius, assis, obolus.

λιγάنη, vide مَهْمَهْ .

λιγάنη fissura; derivatio.

λιγάنη, اَمْكَنْ, اَوْهَهْ στατήρ, stater, statera.

λιγάنη polaris regio; efr. assyr. istunu.

λιγάنη manubrium.

λιγάنη, vide حَفَّ .

λιγάنη, vide كَنْ .

أَلْ et, etiam, quoque; أَفْ... أَفْ tum ... tum.

أَعْلَى neque.

أَمْ أَفْ etiam nunc. أَفْ... أَفْ post نَهْ, neque ... neque.

أَفْ ne quidem.

أَفْ pro اَفْ etsi, quamvis, saltem.

أَمْ أَفْ saltem nunc.

أَفْ vel etiamsi.

أَفْ etsi, vel etiam cum.

جَنْسُهُ juncus, scirpus; *cfr. heb.*
شَرْبَدَةُ, et ar. غَرْبَةُ salix.
جَنْسُهُ et derivata, vide جَنْسُهُ .
جَنْسُهُ structor, murator,
lapicida, *id. q. ἐργολάβος.*
جَنْسُهُ et جَنْسُهُ purpura.
جَنْسُهُ color purpureus.
جَنْسُهُ ḥَاجِيَّةُ, argentum.
جَنْسُهُ vide جَنْسُهُ .
جَنْسُهُ et جَنْسُهُ , ḥَاجِيَّةُ, גַּדְעָן, mensura.
جَنْسُهُ tympanum.
جَنْسُهُ , vide جَنْسُهُ .
جَنْسُهُ et alicet
formæ, vide جَنْسُهُ .
جَنْسُهُ v. جَنْسُهُ .
جَنْسُهُ et جَنْسُهُ murator, architecta.
جَنْسُهُ farina; persice اَرْز
= مَحْسَنًا .
جَنْسُهُ , vide جَنْسُهُ .
جَنْسُهُ vel جَنْسُهُ fibræ palmarum.
جَنْسُهُ , جَنْسُهُ , f. جَنْسُهُ vitulus,
juvenca.
جَنْسُهُ , جَنْسُهُ , جَنْسُهُ arca.
جَنْسُهُ , cedrus, pinus; جَنْسُهُ اَنْجَار
grana cedri *vel* pini.
جَنْسُهُ Aph. vocis جَنْسُهُ .
جَنْسُهُ , vide جَنْسُهُ .
جَنْسُهُ menta.
جَنْسُهُ sturnus.
جَنْسُهُ baculus, malleus.

جَنْسُهُ — In part. exstat جَنْسُهُ ,
جَنْسُهُ fugiens, distans.
Pa. جَنْسُهُ abiit, discessit, pere-
grinatus est; abegit.
جَنْسُهُ , جَنْسُهُ ; pl. جَنْسُهُ iter,
via; status, modus, consuetudo,
ratio vitae, religio. جَنْسُهُ viator; جَنْسُهُ وَالْجَنْسُهُ tertia
vice; جَنْسُهُ سِبْعَةُ جَنْسُهُ una veni-
mus; جَنْسُهُ bivium
viarum.
جَنْسُهُ viator. جَنْسُهُ مَحْمَدَانِي
proverbium divulgatum.
جَنْسُهُ part. præs. Pe. - it.
subst. hospes, peregrinus, via-
tor; via, arx. جَنْسُهُ hospitium.
جَنْسُهُ profectio, peregrinatio,
hospitalitas.
جَنْسُهُ اَخْرَقَنِي, virtus.
جَنْسُهُ bonus, virtute præstans.
جَنْسُهُ virtutis praxis.
جَنْسُهُ اَخْرَقَنِي αἰρετικός; pl. m.
جَنْسُهُ اَخْرَقَنِي hæreticus.
جَنْسُهُ et جَنْسُهُ اَخْرَقَنِي hæresis.
جَنْسُهُ اَخْرَقَنِي πιστός, pistor.
جَنْسُهُ , pl. جَنْسُهُ اَخْرَقَنِي leo;
elephantiasis جَنْسُهُ وَالْجَنْسُهُ chamaeleon; planta.
جَنْسُهُ et جَنْسُهُ leæna;
pl. جَنْسُهُ et جَنْسُهُ .

لَمْتَنْ, f. **لَمْتَنْهَا** leprosus, elephan-
tiasis laborans.

لَا وَمِنْهَا elephantiasis.

أريانوس arianus : sectator Arii.

|Lāwī| arianismus.

مَرْسُونْ, مَرْسُونْ, مَرْسُونْ
Mars : nomen dei et planetæ;
ferrum apud chimistas.

لَوْفُ، usitatus مُتَّسِعٌ، fut. تَلَاقٌ
 longus, abundans fuit, duravit.
 Pa. لَوْفٌ sicut Pe. — it. Aph.
 verbi لَوْفٌ.

Aph. γῆρας prolongavit, exten-
dit; *cum* καὶ *vel* καὶ *person.*
moram prostravit alicui, co-
piose dedit *orationem* etc.

لُوْنِيْتَه longitud, prolixitas; trop. excellentia, meritum.

longitudinalis.

أَوْمَحَ longus, abundans;
f. **أَوْمَحَا**, **أَوْمَحْنَا**; *pl.* **أَوْمَحَنَا**.
أَوْمَحَنَا *ut* **أَوْمَحَنَا**.

أَوْمَاحٌ longe, prolixo, abundanter.

أَوْدُونْتَ لِهَوْمَهَا .

أَوْدَا f. ; it. أَوْفَتْ , أَوْفَا , أَوْفَتْ .
 آوْجَرْ , initium, principium,
 principatus ; pl. أَوْدَا , أَوْفَهْ ,
 أَوْدَاهْ .

أَوْدَى, *usitatius* حُدَى, ἀρχεῖον, archivum, bibliotheca.

أَرْشِيفِيُّوسْ archivarius, bibliothecarius.

أَوْفَمُ, **أَوْهَدُ**; **أَوْفَمُ** ἀρχῶν, princeps, dux.

πρίντεπς ad principem pertinens.
πρίντεπος ἀρχῶν, αὐτος, princeps.

Ἄρχιεπίσκοπος, archidiaconus.

أَوْصَفَهُ ἀρχιατρός, princeps medicorum : archiatrus.

τάλασσα; ὁ δρυγηστής, saltator.
τάλασσα; ὁ δρυγηστός, saltatio,
chorea.

ܐܼܾܰ Aram, nomen filii Sem et
regionis Syriae.

ܐܪܡܰܝܼ aramaice, syriace.

اراماوس aramaeus, syrus.

جَنْتِيلِيُّ ethnicus, gentilis.

أَنْجُونْيَهْ ethnics.

τόσοι ἄρουρα, currus.

أَوْمَدَهُ, *fem.* أَوْمَدَةٌ, *pl.* أَوْمَدَهُ, أَوْمَدَهُ, *viduus, vidua; cf. heb.* וְמַדָּה, *ar.* أَوْمَدَهُ.

﴿مُؤْلِي﴾, v. den. viduus fuit, vi-
duavit.

وَمُكْمِلًا viduitas.

أَوْمَنْهُ, *pl.* وَمَنْلَأُونَ *ἀρμένον*, *navis*,
malus *navis*.

أَوْهُدٌ *hodus*, caper silvestris.

أَوْنَدٌ *f.* *أَوْنَدٌ* *lepus*.

أَوْنَدٌ *et* *أَوْنَدٌ* *mus campes-*
tre.

أَوْهُصٌ *pl.* *أَوْهُصٌ* *αἵρεσις*,
hæresis.

أَوْهِمَةٌ *haereticus.*

أَوْهُنَّا *aqua hordei decocti.*

أَوْهُنَّا *fut.* *أَوْهُنَّا*, *ar.* عَرَضٌ,
heb. קָרֵה, *cum accusat.* per-
sonæ, *vel cum* أَوْهُنَّا, occurrit,
obviam ivit, contradixit, res-
tituit, aggressus est; accidit.

Pa. أَوْهُنَّا *sicut* *Peal.*

Aph. أَوْهُنَّا *sicut* *Peal.*

أَوْهُنَّا *occursus*; أَوْهُنَّا
in occursum, obviam.

أَوْهُنَّا *id.*

أَوْهُنَّا *occursus, disputatio.*

أَوْهُنَّا *contradicens, refutans.*

أَوْهُنَّا *disputatio, controver-
sia, refutatio.*

أَوْهُنَّا *polemicus, f.* أَوْهُنَّا.

أَوْهُنَّا *occursus, disputa-
tio.*

أَرْضٌ *أَرْضٌ*, *heb.* אַרְצָן, *ar.* أَرْضٌ ;
pl. أَوْهُنَّا *terra, regio, ager.*

أَوْهُنَّا *civis*; أَوْهُنَّا
mundani; *c. suff.* أَوْهُنَّا *terra*
mea, etc; *it. v.* أَوْهُنَّا .

أَوْهُنَّا *et* أَوْهُنَّا *terrestris.*

أَوْهُنَّا *pl.* أَوْهُنَّا ; *f.* أَوْهُنَّا ,

أَوْهُنَّا *terrestris.*

أَوْهُنَّا *Aph. verbi* .

أَوْهُنَّا *v.* أَوْهُنَّا .

أَفْعَلٌ *fut.* أَفْعَلٌ *contudit,*
fregit, percussit, conquassa-
vit arborem; cfr. أَفْعَلٌ .

أَفْعَلٌ *malleator.*

أَفْعَلٌ *actio contundendi.*

أَفْعَلٌ - *Cf.* أَفْعَلٌ .

Pael أَفْعَلٌ *sanavit, curavit,*
pacavit, reprehendit; — it.
Aph. verbi أَفْعَلٌ .

أَفْعَلٌ *acificans.*

أَفْعَلٌ *sanatio, pacatio.*

أَفْعَلٌ *Aph. verbi* أَفْعَلٌ .

أَفْعَلٌ *fut.* أَفْعَلٌ *fudit, effudit*
*aquam, sanguinem, benedi-
ctiones, maledictiones; diffudit,*
sparsit. أَفْعَلٌ *se liben-
ter obtulit.*

Ethpe. أَفْعَلٌ *pass.*; *trop.* lapsus
est, ruit; *c.* أَفْعَلٌ *irruit in,*
c. كَلَّا adhæsit, se addixit.

أَفْعَلٌ *effusor.*

أَفْعَلٌ *effusio; trop.* libertas in
aliqua re.

أَفْعَلٌ *effusus, dissolutus,*
fluidus; trop. intentus rei.

أَفْعَلٌ *addictus.*

segregatus a.

أَحْمَدَهُ effusio, liquefactio;

trop. libertas in aliqua re.

أَحْمَدَهُ vel لِسْلَا dilatatio

oculi.

أَحْمَدَهُ effusio.

أَحْمَدَهُ fluidus.

أَحْمَدَهُ fluiditas.

أَحْمَدَهُ , vide لِيْفَهُ .

أَحْمَدَهُ desertum, hebr. רְשָׁבָן .

أَحْمَدَهُ , vide حَلَّ .

أَحْمَدَهُ , vide حَلَّ .

أَحْمَدَهُ m. et أَحْمَدَهُ f.; pl. m. أَحْمَدَهُ , f. أَحْمَدَهُ testiculus.

أَحْمَدَهُ , vide حَدَفَ .

أَحْمَدَهُ , f., it. أَحْمَدَهُ ; pl. أَحْمَدَهُ et مَحْمَدَهُ assyr.

iskaru, jugerum, prædia.

أَحْمَدَهُ et أَحْمَدَهُ , vide حَدَفَ .

أَحْمَدَهُ acacia vel buxus.

أَحْمَدَهُ , pro حَلَّ , vide حَلَّ .

أَحْمَدَهُ funis, rudens; it. imperat.

Aph. verbi حَلَّ .

أَحْمَدَهُ id. q. أَحْمَدَهُ .

أَحْمَدَهُ , fut. مَهْمَدَهُ incantavit ;

cfr. حَفَ .

أَحْمَدَهُ incantator, magus.

أَحْمَدَهُ incantatio, ars magica.

أَحْمَدَهُ incantatio.

أَحْمَدَهُ incantator.

أَحْمَدَهُ Aph. verbi حَفَ .

أَحْمَدَهُ , pers. شِنْجَهُ hospitium, domus.

أَحْمَدَهُ , أَحْمَدَهُ , أَحْمَدَهُ expreced. et suffixo posses-

sionis persico قَنْ , qui curam habet hospitum, procurator.

أَحْمَدَهُ hospitalitas.

أَحْمَدَهُ hosipes ; it. sicut حَفَ , vide حَفَ .

أَحْمَدَهُ , vide حَفَ .

أَحْمَدَهُ f., a rad. حَدَّ , c. l prosthet., in st. est. حَدَّ et حَدَّ , c. suff.

أَحْمَدَهُ etc., fundus, ima pars ; pl. أَحْمَدَهُ , أَحْمَدَهُ , in pl. const.

أَحْمَدَهُ nates ; cfr. شَهَّ شَهَّ ; ar. سَهَّ سَهَّ , et سَهَّ , pl. أَسْهَاهَ .

أَحْمَدَهُ , أَحْمَدَهُ f., pl. حَلَّ febris.

أَحْمَدَهُ , vide حَدَّ , حَدَّ , sub حَدَّ .

أَحْمَدَهُ vide حَدَّ .

أَحْمَدَهُ utinam, semper seq. حَوْجَهُ .

أَحْمَدَهُ struthiocamelus, vox persica.

أَحْمَدَهُ occludens ; inde qui merces sub clavi habet, spec. in navi oneraria.

أَحْمَدَهُ et أَحْمَدَهُ contr. a

أَحْمَدَهُ et مَهْمَهَ cum aleph prostheto-*lico*, anno proxime præce-
dente.

scalprum, scalpellum.
et **لِوْلِي**, vide sub **لو**.

لِيُّ, fut. **لِيَتْ**; imp. **لِي**, fem. **لِيَة**,
pl. m. **لِيَل** vel **لِوْلِي**, f. **لِيَتْلِي** vel
لِيَتْسِي; inf. **لِيَنْ** venit, advenit;
pervenit *ad exitum, ad finem,*
processit; contigit, accidit;
ad se rediit *ab ebrietate;*
convenit, concubuit. حَدَّبْ حَدَّبْ
لِيَلِي, temere, inconsulto fecit.
كَدْ لَلِي in mentem ei venit ut.

Pa. لَلِي venit.

Aph. لَمَّا, imper. لَمَّا, venire
fecit, adduxit, perduxit, pro-
duxit *librum, testimonium;*
sustinuit.

لَمَّا كَدْ لَمَّا creavit, produxit.

لَمَّا حَلَّ حَلَّ diligenter con-
sideravit *rem.*

لَمَّا أَمْبَأْ حَفَّادَةَ quasi addueas
ad dicendum: verbi gratia, ut.

Ettaph. لَمَّا لَيِّ adductus est;
contigit, successit *res.*

لَلِي, لَمَّا p. præs. *Peal.*

لَمَّا adventus.

لَوَلَمَّا id.

لَمَّا viator.

لَمَّا مَلَمَّا, مَلَمَّا et لَمَّا مَدَّا adven-
tus.

لَمَّا introductory.

لَمَّا adductio, productio;
apparatus rei.

لَمَّا مَدَّا adducens;
لَمَّا مَدَّا canalis, aquæ-
ductus.

لَمَّا مَدَّا adductio.

لَمَّا مَدَّا derivatus.

لَمَّا مَدَّا derivatio, propensio.

لَمَّا مَدَّا furnus.

لَمَّا مَدَّا مَدَّا xِثِرِي, æther; it.
خِثِرِي, polenta.

لَمَّا مَدَّا vel لَمَّا مَدَّا æthereus.

لَمَّا مَدَّا, vide لَمَّا مَدَّا.

لَمَّا مَدَّا لَكَفَّا et لَمَّا مَدَّا لَكَفَّا اثِلِيَّتِي, athleta, vir fortis, heros.

لَمَّا مَدَّا لَكَفَّا more athletarum,
fortiter.

لَمَّا مَدَّا et لَمَّا مَدَّا pugna,
fortitudo.

Ettaph. لَكَفَّا verb. denom.
more athletarum pugnavit,
forti animo fuit.

لَكَفَّا eclipsis lunæ.

لَمَّا, vide لَمَّا.

لَمَّا Aph. verbi لَ.

لَمَّا گِھِیکَنْ ethica, scientia
moralis.

لَمَّا گِھِیکَنْ ethicum.

لَمَّا, pl. لَمَّا asina; لَمَّا حَنْ
pullus asinæ, asinus, pl. لَمَّا
لَمَّا asini.

لَمَّا, لَوَلَمَّا pl. لَوَلَمَّا et لَوَلَمَّا lo-
cus, regio, sedes provinciae;

in sensu figurat. via, potestas,
opportunitas; ; لَمْ يَرِدْ vel حَلَافُهُ ،
ubi; مَنْ يَرِدْ vel مَنْ يَأْتِي
unde; حَلَافُهُ in multis
variisque locis.

حَدَّ pro حَلَافُهُ , ex prop. دَعَ et
لَمْ يَرِدْ , ar. إِنْ , post, pone,
in vestigio; contra, adversus;
حَدَّ , vel حَدَّ وَمَنْ يَرِدْ , die
sequenti; حَدَّ وَمَنْ يَأْتِي , capite

inverso: حَدَّ حَدَّ , successive;
فِي حَدَّهُ et فِي حَدَّهُ
post, postquam.
فِي حَدَّهُ فِي حَدَّهُ
posteaquam.

حَدَّ فِي حَدَّهُ posterioritas.
الْأَوْمَانِيَّةُ et الْأَوْمَانِيَّةُ regionalis,
localis, terrestris, popularis.
الْأَوْنَصِيَّةُ localitas.
الْأَوْمَانِيَّةُ τριόδιον, triodium.



ح

ه secunda littera alphabeti
Syrorum; numeri nota valet:
ه vel ه = 2, ب vel ب =
2000. ه = 20000; ubi
vero ب, præfigitur eadem si-
gna numeros ordinales ex-
primunt, v. g. ه = secun-
dus; etc.

ه præp. insepar; cum aff.
ه,
ه, ه, ه, ه, ه, ه, ه, ه, ه, ه.
Indicat: 1) locum in quo ali-
quid est, vel adesse putatur:
ه مَحْلًا in templo, هَمْسَة
in principio, هَفْوَهْ prope
portam, هَمْ inter vos.

2) societatem et comitatum:
ه مَلِكًا cum exercitu ve-
niens.

3) statum, conditionem: هَمْ
in ira. هَمْ ea conditione
ut.

4) tempus: هَلَلًا noctu.
5) rationem et instrumentum:
هَمْ مَهْ occidit gladio:
هَمْ دَمْتَهِ vidit oculis
suis. ه per te.

- 6) pretium: حَدَّهُ وَهَمْ emit eum talento argenti.
7) causam: ob, propter, لَهُمْ حَوْمَا siti morior.
8) motum: بَهْ حَمْ in illos impetum fecit.
9) finem, scopum: لَهُمْ حَمْ non propter compotationem.

هَمْ, vide حَمْ .
vel حَبْا spina alba, rubus;
trabs, torcular; mensura; cfr.
βάτος, et heb. حَبْ .
βάτος, rubus.
هَمْ, vide حَمْ .
هَمْ, دَاهِمٌ .
هَمْ, vide حَمْ .
هَمْ f.; pl. حَمْا, vel حَمْا et حَمْا puteus, fovea.
هَمْ, دَاهِمٌ , ride حَمْا .
هَمْ, دَاهِمٌ .
هَمْ statim, nunc.

هَمْ, fut. حَمَاء male fuit,
displieuit, malus fuit, cor-
ruptus est; seq. هَمْ, pejor
fuit. Part. pres. حَامِأ .
هَمْ, دَاهِمٌ , pl. حَمَاء .
etc.

Ethpe. حـ اخـ اعـ , id. q. *Peal.*

Aph. حـ اخـ اعـ et حـ ادـ malefecit, male tractavit, læsit, affixit; seq. حـ مـ , pejus fecit. *Part.* *præs.* حـ اخـ اعـ , حـ اخـ اعـ ; *f.* حـ اخـ اعـ , etc.

حـ اخـ اعـ malum, calamitas.

حـ اخـ اعـ , sed usitatus حـ سـ part. pass.: *f.* حـ اخـ اعـ , *emphat.*

حـ اخـ اعـ ; *pl. m.* حـ اخـ اعـ , *emphat.*

حـ اخـ اعـ ; *f.* حـ اخـ اعـ , *emphat.*

حـ اخـ اعـ , malus, improbus, turpis, infastus, tristis; *substant.* Satan; *it. in pl.* *emphat.* *substantive*: malum, infortunium, scelus, peccatum; حـ سـ حـ سـ male; حـ سـ حـ سـ infelix.

حـ اخـ اعـ male, turpiter.

حـ اخـ اعـ , *pl.* حـ اخـ اعـ pravitas, malignitas, aegritudo, infortunium, tristitia.

حـ اخـ اعـ pauper, miser.

حـ اخـ اعـ paupertas, miseria.

حـ اخـ اعـ inopia.

حـ اخـ اعـ , حـ اخـ اعـ , lædens, corrumpens.

حـ اخـ اعـ maleficium, damnum, iniquitas.

حـ اخـ اعـ , *pl.* حـ اخـ اعـ , et حـ اخـ اعـ — pupilla oculi.

cfr. حـ حـ .

حـ دـ dim. pupilla; puerulus.

حـ حـ puer, infans.

حـ دـ diminut. parvulus, infans.

حـ حـ حـ , *pl.* حـ دـ حـ حـ puellula, infans.

حـ حـ et حـ حـ part. admir.

βαρβαρι, pappæ!

حـ حـ حـ fovea leonis.

حـ حـ حـ panthera; jugum aratri.

حـ حـ حـ melongena.

حـ حـ pers. حـ بـ , hortus.

حـ حـ حـ cantharus, guttanium, vas.

حـ حـ حـ , *pl.* حـ حـ حـ cantharus parvus; bulla aquæ.

حـ حـ حـ tapetum.

حـ حـ حـ macies.

حـ حـ حـ id.

حـ حـ fut. حـ حـ impeditus est; claudicavit; *cfr.* حـ حـ .

Pa. حـ حـ retardavit.

Ethpa. حـ اخـ اعـ impeditus est, retardatus est.

حـ حـ , *it.* حـ حـ impedimentum.

حـ حـ حـ impedimentum, mora.

حـ حـ , *fut.* حـ حـ clamat, reprehendit, vituperavit; finxit, effutivit.

حـ حـ loquacitas, commentum.

لُوكَا et لُوكَا loquax, vaniloquus.

لُوكَا loquacitas.

لُوكَا muliereula.

لُوكَا loquax; cf. etiam infra لُوكَا.

لُوكَا, لُوكَا, vaniloquus, irridens, stolidus.

لُوكَا deliratio, vaniloquium.

لُوكَا, fem. لُوكَا, ar. بَنْلَهُ, mulus, mula.

لُوكَا, fut. لُوكَا clamavit, conquestus est.

Pa. لُوكَا vociferatus est, conquestus est, imploravit, appellavit, morbum allegavit. لُوكَا questus.

لُوكَا exclamatorius.

لُوكَا clamor, vociferatio, exclamatio, questus, provocatio.

لُوكَا exclamatorius.

لُوكَا et لُوكَا imploratio auxilii.

لُوكَا id.

لُوكَا, fut. لُوكَا clausit, impedivit, retinuit.

Ethpe. لُوكَا defecit, macilentus factus est.

Pa. لُوكَا clausit, retinuit, de-

ficere fecit, infirmum reddidit.

Ethpa. لُوكَا pass.

لُوكَا part. præs. Peal; it. subst. ut لُوكَا.

لُوكَا, لُوكَا repagulum; fragmena lapidum et figulinorum.

لُوكَا macilentus.

لُوكَا macilentia, ariditas.

لُوكَا ruga; repagulum, lapis.

لُوكَا, id. q. لُوكَا.

لُوكَا et لُوكَا lapis ad claudendum januam; cfr. لُوكَا.

لُوكَا lapis magnus, fundamentum.

لُوكَا, ex لُوكَا et لُوكَا, propterea quod, quia; لُوكَا etsi, لُوكَا eo quod non. لُوكَا ex لُوكَا et لُوكَا, propterea, ideo, ergo, propterea quod.

لُوكَا, vide لُوكَا.

لُوكَا, fut. لُوكَا commentus est, falso dixit, deliravit.

Part. pass. لُوكَا fictus, falsus.

Ethpe. لُوكَا passiv.

Pa. لُوكَا id. q. Peal.

Aph. لُوكَا id.

لُوكَا, لُوكَا commentum, deliramentum, ineptiae.

لُوكَا et. لُوكَا effutiens, insulsa dicens.

ج	Pa. جَهَّافٌ inquisivit, scrutatus est ; patetfecit, monstravit ; c. acc. vel جَهَّافٌ rei , annuntiavit, exposuit, prædixit ; restauravit <i>domum</i> .
ج	Ethpa. جَهَّافٌ pass. - it. apparuit, ortus est.
ج	Palp. جَبْرِي , ut <i>Peal</i> .
ج	Ethpalp. جَبْرِي turbatus est, confusus est.
ج	دَهْوَحَةٌ turbatio, confusio.
ج	مَحْبَرَةٌ conturbatio, insanitas.
ج	، vide جَهَّافٌ .
ج	بَادِبَانٌ , pers. جَهَّافٌ , lacinia chlamydis.
ج	- Ethpa. جَهَّافٌ laeta- tus est, se oblectavit.
ج	لَهْوٌ lætitia, oblectatio.
ج	، fut. جَهَّافٌ effutivit , falso dixit.
ج	et جَهَّافٌ insulsa loquacitas, delirium.
ج	فَانُوسٌ vanus.
ج	عَنْ جَهَّافٍ ut جَهَّافٌ .
ج	, fut. جَهَّافٌ inquisivit, scrutatus est, exploravit ; restauravit <i>domum</i> ; prodire fecit, patetfecit, demonstravit, promulgavit, delator fuit, c. جَهَّافٌ pers.
ج	Ethpe. جَهَّافٌ restauratus est.
ج	Pa. جَهَّافٌ sparsit, disseminavit, inspersit, dissipavit.
ج	Ethpe. جَهَّافٌ pass.
ج	sparsit, dispersit, distribuit, dissipavit.
ج	Ethpa. جَهَّافٌ pass.
ج	sparsio, inspersio.
ج	جَهَّافٌ spargens ; distribuens <i>fructus, dulciaria</i> in nuptiis.
ج	sparsim.
ج	جَهَّافٌ dispersio.
ج	جَهَّافٌ dispersio, dissipatio, distributio, id quod dispergitur ; it. <i>vide</i> جَهَّافٌ .

مَحْوَلٌ dissipator.	Aph. مَحْوَلٌ subobscure apparuit sol ; nnq. illuminavit.
مَحْوَلٌ et مَحْوَلٌ sparsim.	Schaph. مَحْوَلٌ glorificavit, gloriatus est.
مَحْوَلٌ dispersio.	Eschtaph. مَحْوَلٌ gloriatus est.
مَحْوَلٌ - مَحْوَلٌ stupefactus est.	مَحْوَلٌ aurora, crepusculum ; nnq. meridies ; it. ut مَحْوَلٌ .
مَحْوَلٌ stupor, terror.	مَحْوَلٌ obscurus ; stupefactus.
مَحْوَلٌ et مَحْوَلٌ id.	مَحْوَلٌ obscure.
مَحْوَلٌ , fut. مَحْوَلٌ et مَحْوَلٌ quiœvit, cessavit ; constituit, habitavit.	مَحْوَلٌ obscurus.
Ethpe. مَحْوَلٌ in pace fuit, quievit a, v. g. ab inimicis c. مَهْمَة pers. vel rei, tranquillus fuit.	مَحْوَلٌ crepusculum, diluculum, fulgor.
Pa. مَحْوَلٌ requiescere fecit ; blanditus est.	مَحْوَلٌ illuminans, lucem admittens : dicitur substantive de fenestra (cfr. gall. lucarne.) ; f. pl. مَحْوَلَاتٌ , مَحْوَلَاتٌ ; f. مَحْوَلَاتٌ , مَحْوَلَاتٌ , etc. ; pl. m. مَحْوَلٌ , مَحْوَلٌ , gloriatus, jactor.
مَحْوَلٌ et مَحْوَلٌ cessatio, quies, silentium.	مَحْوَلٌ vel مَحْوَلٌ gloriatio.
مَحْوَلٌ socors, inurbanus.	مَحْوَلٌ id.
مَحْوَلٌ quietus, otiosus, vacuus ; comis, mansuetus.	مَحْوَلٌ arrogantia.
مَحْوَلٌ tranquille, silenter.	مَحْوَلٌ , fut. مَحْوَلٌ puduit, confusus est, c. مَهْمَة vel مَهْمَة pers. aut rei. Part. pass. مَحْوَلٌ , ut مَحْوَلٌ .
مَحْوَلٌ quies, silentium.	Aph. مَحْوَلٌ pudefecit, confudit, inhonoravit.
مَحْوَلٌ - Aph. مَحْوَلٌ fulsit.	مَحْوَلٌ , st c. مَحْوَلٌ pudor, confusio, dedecus, ignominia, libido.
مَحْوَلٌ fulgor.	
مَحْوَلٌ et مَحْوَلٌ macula alba, morbus cutis.	
مَحْوَلٌ fulgor.	
مَحْوَلٌ fulsit; vix usitat. in Peal.	

بُرْتَنْدَ, f. بُرْتَنْدَ ; pl. f. بُرْتَنْدَ, pudicus.

بُرْتَنْدَ verecundia, pudor.

بُرْتَنْدَ, بُرْتَنْدَ confusus, pudefactus, turpis.

بُرْتَنْدَ, f. بُرْتَنْدَ confusionem afficiens.

بُرْتَنْدَ confusio.

بُرْتَنْدَ res cocta, cibus ; tunica.

بُرْتَنْدَ, pl. بُرْتَنْدَ, et بُرْتَنْدَ canalis, vas excavatum in quo coquitur panis ; it. f. bubalus seu vacca silvestris.

بُرْتَنْدَ, f. بُرْتَنْدَ ; pl. بُرْتَنْدَ bubalus.

بُرْتَنْدَ, fut. بُرْتَنْدَ, periit, desertus est ; cfr. بُرْتَنْدَ et بُرْتَنْدَ.

بُرْتَنْدَ fatuus, nesciens loqui.

بُرْتَنْدَ fatuitas. linguæ impedimentum.

بُرْتَنْدَ, vacuitas, abyssus.

بُرْتَنْدَ id.

بُرْتَنْدَ aquilo.

بُرْتَنْدَ, fut. بُرْتَنْدَ marcuit, languit, percoctus est, tritus est. Aph. بُرْتَنْدَ marcidum reddidit, percoxit, trivit.

بُرْتَنْدَ marcor.

بُرْتَنْدَ morsus.

بُرْتَنْدَ , vide بُرْتَنْدَ .

بُرْتَنْدَ id quod decidit de segete ante messem.

بُرْتَنْدَ pers. بوته, catinus aurifabrorum.

بُرْتَنْدَ aborigenes, incolæ.

بُرْتَنْدَ pistillum.

بُرْتَنْدَ βολή , effluvium.

بُرْتَنْدَ strepitus, tumultus.

بُرْتَنْدَ, vel بُرْتَنْدَ βουλή , senatus, concilium : sententia, res publica ; princeps, vizirus. - it. vestibulum, ingressus, cfr. بُرْتَنْدَ ; بُرْتَنْدَ concilium, senatus. بُرْتَنْدَ luteum ovi.

بُرْتَنْدَ et بُرْتَنْدَ, pl. بُرْتَنْدَ βουλευτής , senator ; nobilis, curialis.

بُرْتَنْدَ senatoria dignitas.

بُرْتَنْدَ bubo ; cfr. ar. بُرْتَنْدَ .

بُرْتَنْدَ βωμός, ara ; pl. excelsa.

بُرْتَنْدَ - Pa. بُرْتَنْدَ demonstravit, indicavit, ostendit ; intelligere fecit, intellexit.

Ethpa. بُرْتَنْدَ pass. - it. intellexit, consideravit, considerate egit ; part. بُرْتَنْدَ intelligens, considerans, sapiens.

بُرْتَنْدَ, بُرْتَنْدَ intelligentia, judicium, prudentia.

بُرْتَنْدَ examiner.

حُوراً مَحْتِنَمًا prudentia, sapientia.
 حُوراً مَحْتِنَسًا intelligens.
 حُوراً مَحْتِنَةً examen, consideratio.
 حُوراً مَحْتِنَةً بَيْنَ دَنْهُ , حُوراً مَحْتِنَةً بَيْنَ دَنْهُ , distantia,
 interrallum, inter) in medio,
 inter ; c. suff. حُوراً مَحْتِنَةً , دَنْهُ ,
 حُوراً etc. inter me, inter illum,
 inter nos; vel حُوراً مَحْتِنَةً , دَنْهُ ,
 inter me, inter nos, etc. حُوراً
 مَحْتِنَةً دَنْهُ inter me et te etc. ;
 حُوراً مَحْتِنَةً دَنْهُ secum, in
 semetipso.

حُوراً , contr. ex حُوراً vel حُوراً ,
 inter, in, apud, per, ope ;
 حُوراً ... حُوراً , inter ... et ... ,
 it. tam ... quam ; حُوراً كُلَّا سَبْعَ حُوراً
 inter te et fratrem tuum ;
 حُوراً حُوراً دَخْفَنَةً , دَخْفَنَةً dixit
 in semetipso ; حُوراً مَحْتِنَةً ex. حُوراً
 مَحْتِنَةً interea quod, dum.
 حُوراً مَحْتِنَةً , vide s. لَعْنَةً .

حُوراً Exstat tantum part.
 Pacl vel Aph. حُوراً مَحْتِنَةً vel حُوراً
 i. e. cessans, tardans, otians.
 حُوراً مَحْتِنَةً mora, procrastinatio,
 cunctatio ; حُوراً مَحْتِنَةً , sine
 interruptione.

حُوراً مَحْتِنَةً byssus.
 حُوراً مَحْتِنَةً byssinus.
 حُوراً مَحْتِنَةً , حُوراً مَحْتِنَةً ellychnium,
 lampas.

حُوراً - حُوراً Part. pass. حُوراً
 carie, putredine vitiatus ; cfr.
 حُوراً .
 حُوراً مَحْتِنَةً hujusmodi vitiatio.
 حُوراً مَحْتِنَةً βύπος, amphora ansata.
 حُوراً مَحْتِنَةً βυκάνη, buccina.
 حُوراً مَحْتِنَةً , حُوراً مَحْتِنَةً buccinator.
 حُوراً مَحْتِنَةً βάκλος, baculus.

حُوراً , fut. حُوراً incultus
 fuit, sterilis fuit, caruit ; trop.
 obstupuit ; cfr. حُوراً .
 Ethpa. حُوراً مَحْتِنَةً incultus fuit.
 Aph. حُوراً مَحْتِنَةً incultum, sterilem
 fecit.
 Ethpalp. حُوراً مَحْتِنَةً obstupuit.
 حُوراً مَحْتِنَةً ut حُوراً مَحْتِنَةً .
 حُوراً مَحْتِنَةً incultus, sterilis ; trop.
 ignarus, simplex, stultus.
 حُوراً مَحْتِنَةً sterilitas, simplicitas.
 حُوراً مَحْتِنَةً , vide s. لَعْنَةً .
 حُوراً مَحْتِنَةً incultus, sterilis.
 حُوراً مَحْتِنَةً sterilitas.

حُوراً مَحْتِنَةً veredarius.
 حُوراً مَحْتِنَةً f., pl. حُوراً مَحْتِنَةً et حُوراً مَحْتِنَةً storea.
 حُوراً مَحْتِنَةً πύργος, turris, columba-
 rium.
 حُوراً مَحْتِنَةً in turre vel columbario
 habitans.

حـ وـ حـ . pl. حـ وـ حـ ; vide حـ وـ حـ .

حـ وـ حـ borax.

حـ وـ حـ , pers. بـ رـ مـ , olla lapidea. حـ وـ حـ بـ رـ سـ ئـ , coriarius ; f. حـ وـ حـ , pl. حـ وـ حـ .

حـ وـ حـ ars coriarii.

حـ وـ حـ borax ; pulmentum.

Lac - حـ , fut. حـ pernoctavit, sedit, versatus est. *Aph.* حـ pernoctare sivit ; retinuit.

حـ مـ , pl. حـ مـ pernoctatio, vigilia sacra, jejunia.

حـ m. , in forma contracta حـ , pl. حـ مـ ; st. constr. حـ مـ ; in singul. c. suff. حـ مـ , domus mea ; حـ مـ , domus ejus, etc. ; in plur. حـ مـ , domus meæ, حـ مـ , domus nostræ, حـ مـ domus eorum, etc. Domus, mansio, cubiculum ; trop. familia, strophe ; حـ seq. al. nomine significat locum in genere : حـ مـ gazophilacium, locus telonii, حـ مـ refugium ; حـ مـ domus captiorum : career ; حـ مـ receptaculum aromatum ; thuribulum ; rel. respondet prae-

pos. : in, intra حـ مـ in corbona ; vel tandem expletivum est : حـ مـ مـ ا in caverna. In his casibus saepe omittitur præpos. præcedens v. g. حـ مـ مـ ا حـ مـ in eluserunt eum in carecere, pro حـ مـ .

حـ مـ dimin. domuncula.

حـ مـ verb. denomin. in domo recepit, domesticum fecit, cieuravit, cognatum sibi redidit, conjunxit, appropriavit. *Ethpali* حـ مـ familiaritate, consuetudine junctus est, affinis fuit, in relatione versatus est.

حـ مـ et حـ مـ adv. domo, privatim, proprie.

حـ مـ , حـ مـ domesticus, familiaris, propinquus, cognatus, affinis, similis, proprius. حـ مـ cognatio, familiaritas, consuetudo, affinitas, famulatus, proprietas, relatio ; حـ مـ familiaris, socius.

حـ مـ domesticus, formans adjectiva nomen.

حـ مـ hujusmodi adjectivum.

حـ مـ مـ مـ societas, consortium.

Lac , fut. حـ مـ diripuit, abstulit, spoliavit ; sprevit, cfr.

حـمـمـاـ ئـيـكـهـ مـعـنـ . بـوـ زـهـ .	contemptus, irrisio, ludibrium.
nomen meum spernitis.	
<i>Ethpe.</i> حـمـمـاـ ئـاـتـاـ direptus est.	دـهـمـاـ <i>id.</i>
<i>Pa.</i> حـمـمـاـ violenter abstulit.	مـحـمـسـاـ derisor.
<i>Aph.</i> حـمـمـاـ spoliauit.	مـحـمـسـمـاـ derisio.
<i>Palp.</i> حـمـمـاـ repetitis vicibus diripuit, praedatus est.	حـلـلـاـ <i>vel</i> حـمـمـاـ accipiter.
<i>Ethpalp.</i> حـمـمـاـ ئـاـتـاـ pass.	حـلـفـاـ falconarius.
حـمـمـاـ ، حـمـمـاـ direptor, spoliator.	
حـمـمـاـ ، حـمـمـاـ prædonum more.	
حـمـمـاـ ، حـمـمـاـ ، حـمـمـاـ rapacitas.	
حـمـمـاـ prædatio.	
حـمـمـاـ et حـمـمـاـ <i>id.</i>	
حـمـمـاـ ، حـمـمـاـ direptio.	
حـمـمـاـ et حـمـمـاـ spoliator.	
حـمـمـاـ ، حـمـمـاـ direptibilis.	
حـمـمـاـ ، حـمـمـاـ direptibilitas.	
حـمـمـاـ fissura ; <i>cfr.</i> حـمـمـاـ .	حـمـمـاـ quod frangi potest.
حـمـمـاـ et حـمـمـاـ falco ; <i>ar.</i> et <i>pers.</i>	
بـازـ ، <i>vide infra</i> حـمـمـاـ .	
حـمـمـاـ pl. حـمـمـاـ mamma ; <i>trop.</i>	
caeumen montis.	
حـمـمـاـ dimin. <i>præc.</i>	حـلـمـاـ , fut. حـمـمـاـ seminavit,
حـمـمـاـ id. q. حـمـمـاـ .	dispersit.
حـمـمـاـ ، ar. حـمـمـاـ ، byssarius seu	
vestium venditor.	
حـمـمـاـ - <i>Pa.</i> حـمـمـاـ sprevit,	حـمـمـاـ <i>id. q. حـمـمـاـ</i> .
illusit, contumelia affecit, <i>c.</i>	
<i>acc. vel</i> حـمـمـاـ ، <i>pers.</i> ; <i>cfr.</i> בـזـהـ .	
<i>Ethpa.</i> حـمـمـاـ ئـاـتـاـ pass.	حـمـمـاـ , fut. حـمـمـاـ exploravit,
	examinavit.

Pa. حَسْنٌ examinavit, serutatus est, disputationem habuit.

Ethpa. حَسْنٌ pass.

حَسْنًا investigatio, disputatio.

حَسْنًا investigans, examinans, sophista; حَسْنًا مُحَسِّنًا dialectica.

حَسْنٌ, fut. حَسْنٌ et حَسْنٌ probavit, perspexit, examinavit, serutatus est, elegit.

Ethpe. حَسْنٌ pass. كَحْسَنٌ et حَسْنٌ perspectum erit tibi.

Pa. حَسْنٌ enixe inspexit, examinavit.

حَسْنٌ serutator, examiner, probator.

حَسْنَةً exploratio.

حَسْنًا, حَسْنٌ part. pass. exploratus, perspectus, probatus, electus, eximius.

حَسْنَةً probe, accurate.

حَسْنَةً, حَسْنَةً probatio, examen, experimentum, criticus dies *ae-groti*.

حَسْنَةً exploratio, consideratio.

بَحْرٌ حَسْنًا, mare.

حَسْنٌ, fut. حَسْنٌ it., fut. حَسْنٌ agitavit, commovit;

festinavit; trop. libidine inflammavit.

Ethpe. حَسْنٌ pass.

حَسْنٌ agitavit; inquisivit.

Ethpa. حَسْنٌ agitatus est.

Aph. حَسْنٌ agitavit, commovit.

حَسْنًا et حَسْنًا agitatio.

حَسْنًا agitans; rutabulum.

حَسْنًا libidinosus.

حَسْنَةً libido.

حَسْنًا sinus indusii.

حَلْمًا anas.

حَلْمًا et حَلْمًا scintilla.

حَلْمًا id. q. حَلْمًا .

حَلْمًا urceus vinarius; cfr. بَاطِنَةً .

حَلْمًا, cfr. بَطِينَةً , melo.

حَلْمٌ, fut. حَلْمٌ cessavit, vacavit; otiosus, inutilis evasit, defecit, desiit; c. حَلْمٌ cessavit a; c. حَلْمٌ vacavit, dedit operam; حَلْمٌ m. part. pass. cura fuit alieui, c. حَلْمٌ carens, expers, c. حَلْمٌ vel حَلْمٌ; carens, expers, c. حَلْمٌ vel حَلْمٌ mea non refert; it. adjective ut حَلْمٌ .

Ethpe. حَلْمٌ curae fuit c. حَلْمٌ, pers. et حَلْمٌ vel حَلْمٌ rei:

﴿ ﻷ ﺔـ ﻷ ﺔـ ﻷ ﺔـ mihi curæ
fuit de ; — it. otius est.

Pa. ﴿ ﻷ ﺔـ cessare fecit, irritum
fecit, abolevit, abstulit, aver-
tit ; intermisit, omisit.

Ethpa. ﴿ ﻷ ﺔـ pass.

cessatio, abolitio, abroga-
tio.

vacuus, otiosus, inutilis,
irritus, abolitus ; ﴿ ﻷ ﺔـ

episcopus sine diœcesi.

sollicite.

vane, otiose.

cura, diligentia, pro-
videntia.

incuria.

otiosus, inutilis.

inutiliter.

vacatio, cessatio labo-
ris, otium, feriae ; it. ut ﴿ ﻷ ﺔـ .

cessare faciens.

destructio, abolitio.

ornamenti genus in
pariete.

f. terebinthus.

concepit, fut. ﴿ ﻷ ﺔـ , fut. concepit,

in utero gestavit. Part. act.

in utero gestans, concipiens, prægnans ; part.

pass. ﴿ ﻷ ﺔـ conceptus, gestatus.

Ethpe. ﴿ ﻷ ﺔـ et *Ethpa.* ﴿ ﻷ ﺔـ
conceptus est.

Aph. ﴿ ﻷ ﺔـ concipere fecit,
gravidavit.

conceptio, fœtus. it.
adject., abs. ﴿ ﻷ ﺔـ , emphat.

prægnans, gravida.

conceptio, gestatio.

patriarcha.

, vide sub حـ .

vel حـ , fut. حـ ;

imper. m. حـ , f. حـ , pl. m.

infinit. حـ , infin. حـ , it. حـ consolatione consolatus est.

Ethpa. ﴿ ﻷ ﺔـ et ﴿ ﻷ ﺔـ , fut.

imper. حـ , f. حـ , pl. m. حـ et حـ ,

consolationem accepit ; it.

consolatus est, c. حـ pers.

consolatio, exhortatio.

consolatorius.

consolator.

consolabilis.

id. q. حـ ; it. sartago.

manica industrii ; lagena.

(assyr. bilu,) Jupiter planeta.

حَكْبَرُوا et **حَكْبَرْتُ** tabellarius,
cursor.

حُكْمُ وَهُوَ officium cursoris.

حَامِداً, **حَامِدًا**, **حَمْدًا** et **حَمْدًا**, it.
حَامِتًا, **حَامِيًّا**; **حَامِيًّا** pl.; **حَامِيًّا**, **حَامِيًّا** it. **حَامِيًّا** **حَامِيًّا** **بِرْبُرَخ**, tribunal,
حَامِيًّا suggestus, solium.

حَمْرَة, pl. حَمَرَاتٌ tamaris; in pl. parascevæ quæ Nativitatem inter et Quadragesimam occurunt: isthmus.

|אַמְלָה pl. |אַמְלָה ampulla,
vas vitreum, hydria.

حَتْنَا, **حَتْنَم** f.; **pl.** **حَتْنَمًا**, **حَتْنَمًا** ovum, vertex; testiculi.

حَمَدَةٌ verticalis, ovalis.

לְמַתָּא ovo similis.

حَنْدَةٌ، حَنْدَةٌ ; it. ἡλώνια βιρβίον,
vestis, speciatim vestis pontificalis, vestis monachalis.

لِكَنْ , vide sub گه .

حُمَّ، 2^a littera alphabeti
Syrorum; it. *vide s. لَهْ*.

حَدَّا, fut. نَدَّا; حَدَّا, part. act.; حَدَّا do-mus flentium, luctus, funus; c. suff. حَدَّدَ, حَدَّتْ etc. luctus meus, luctus noster.
Ethpe. اَحَدٌ ploratus est.

Pa. حَذَ vehementer flevit; *it.*
ut Aph.

Ethpa. **إِثْپَأْ** vehementer ploratus est.

Aph. أَدْفَ flere fecit.

فُلُجْ fletus.

حَفْتًا fletum excitans; *f.* **حَفْتَهُ**,
pl. **حَفَّاتٍ** præfica.

כְּבָדָל fletus

مُحَمَّداً fletum excitans.

أَحْدَاثُ *id. q.* **حَدَّثُ**

جَحْكَمَةً *sine singul.* uvæ immaturæ, acres.

حَافِّا, حَافِّا et حَادِّا, حَادِّا
اِدَّا atramentarium.

כָּבֵד, fut. **נַחֲלֵה** præcox fuit.

Ethpe. ﴿اَدَم﴾ primogenitus fuit.

Pa. **٦** primus venit, prævenit, prior fuit, præcessit, primicias accepit, primos fructus habuit.

حَمْدَنْ, pl. **حَمْدَنَاتْ** primogenitus; it. particula panis eucharistie a sacerdote consecranda, primitiae; camelus junior.

دَهْنَامَةٌ primum.

جُنْدَهُ الْأَوَّلِ jus primogenituræ.

دَحْمَةُ pullus camelinus.

حَفْتَانُ, *f.* **حَفْتَانًا**; *pl.* **حَفْتَانٌ**, *f.* **حَفْتَانًا** præcox, primus; *in pl.* **حَافِظَاتٍ** **حَافِظَاتُ** *prima*

festivitas : *nativitas Domini.*
دَحْتَاهُمْ præmature.
دَحْتَاهُمْ præcocitas.
دَحْتَاهُمْ f., *f.* **دَحْتَاهُمْ pl.** *f.* **دَحْتَاهُمْ**, *f.* **دَحْتَاهُمْ** primus, primitivus, primogenitus; *it.* prima pluvia, primipara.
دَحْتَاهُمْ anterioritas.

دَهْلَهُهُؤَا *hylax.*
دَهْلَهُهُؤَا et دَهْلَهُهُؤَا lapis repaguli, lapis terminalis; *cfr.* **دَهْلَهُهُؤَا**.

دَهْل - *Part. act. Peal*
دَهْل texens. *f.* **دَهْل** textrix.

دَهْل, *cfr. heb. ذَهَل* et *ar. بَنْ*, sed, vel, certe.

دَهْل et **دَهْل**, *fut.* **دَهْل** inverteavit, senio *vel* usu confectus est, marcuit; **دَهْل**, *f.* **دَهْل** *part. præs.* inveterascens, marcescens; **دَهْل**, **دَهْل**, *f.* *pass.* detritus.

Ethpe. **دَهْل** consumptus est.

Pa. **دَهْل** attrivit, consumpsit.

Ethpa. **دَهْل** pass.

Aph. **دَهْل** deficere fecit.

دَهْل, defectus; *adverbial.* **فِي دَهْل** ex defectu, sine, absque.

دَكْمًا, *pl.* **دَكْمًا** inveteratio, detritio, defectus, inopia; *adject.* vetus, attritus; *in plur.* panni; *adverbial. c.* **فِي دَكْمًا**, *id. q.* **فِي دَكْمًا**.

دَكْمًا vetustas.

دَكْمًا inveteratio, attritio.

دَكْمًا *id.*

حَلْلًا sine; *cfr.* **لَلْلَّا**.

حَلْلًا, *cfr. ar. بَالْلَّا*, cor, animus, mens. **أَنْكَبَ حَلْلًا**, adduxit ad mentem, *scil.* consideravit; *c.* **عَلَلْلَةً** attendit, sibi proposuit.

حَلْلًا *vide s. لَلْلَّا*.

حَلْلَهُهُؤَا pudore, timore afficit; turbavit, ursit.

Ethpa. **دَهْلَهُهُؤَا** pass.

دَهْلَهُهُؤَا terror, stupor, admiration, extasis.

دَهْلَهُهُؤَا obstupefactus.

دَهْلَهُهُؤَا obstupefaciens.

دَكْمَهُهُؤَا, **دَكْمَهُهُؤَا** quercus, ilex.

دَكْمَهُهُؤَا, *id q.* **دَكْمَهُهُؤَا**.

دَكْمَهُهُؤَا, *pers.* **بَرُور**, beryllus.

دَكْمَهُهُؤَا margaritæ.

دَكْمَهُهُؤَا juga.

دَلْلَهُهُؤَا, *compos. e.v præp.* **دَلْلَهُهُؤَا et دَلْلَهُهُؤَا**, cum **لَهُهُؤَا**, tantum, unice, solum, seorsim; *c.*

affix. حَكْسَهُ وَبْ , ego solus ;
حَكْسَهُ وَبْ tu solus, etc.

حَكْسَهُ اِنْدَخْسَبْ verb. *denom.* unicus factus est, solus remansit.

حَكْسَهُ وَانْدَهْ solummodo.

حَكْسَهُ وَوْنَدَهْ solitudo alicuius, singularitas, numerus singularis.

حَلْمَهْ دَلْمَهْ , fut. حَكْمَهْ erosit tinea ; occlusit.

Ethpe. حَادْهَ اِنْدَهْ erosus est.

Pa. حَدْهَ erosit ; protuberantior fuit *iris oculi*.

Ethpa. حَادْهَ اِنْدَهْ occlusus est.

Aph. حَأْدَهْ putruit.

حَدَّهْ intumescentia.

حَدَّهْ et حَدَّهْ id. ; insuper vomitus.

حَدَّهْ tinea.

حَدَّهْ caries.

حَدَّهْ , دَكْهَا part. pass. *Peal* ; it. vomitus.

حَدَّهْ erosio.

حَلَّهْ id. - it. intumescencia.

حَلَّهْ vestes sericæ ex purpura nigricantes.

حَكْهَ , *vide* حَلَّهْ .

حَلَّهْ , fut. حَمَّهْ , confudit,

perturbavit, corrupit ; حَكْمَهْ part. pass. - it. subst. migma, farrago ; frumentum ventilatum.

Palp. حَلْخَهْ id. q. حَكْهَ .

Ethpalp. حَادْهَ اِنْدَهْ pass.

حَمَدْهَ لَهْ , دَهْ حَلَّهْ confusio, perturbatio, corruptio.

حَكْلَهْ confuse, corrupte.

حَكْمَهْ , حَكْمَهْ confusio, inordinatio.

حَمَدْهَ لَهْ confuse, turbulente.

حَمَدْهَ كَهْ confundens, perturbator.

حَهْ حَدَّهْ perturbationi obnoxius.

حَلَّهْ , fut. حَكْمَهْ clausit, obturavit, coercuit spec. os jumenti ; حَكْمَهْ part. pass. - it. mutus.

Ethpe. حَادْهَ اِنْدَهْ pass. - it. trop. obmutuit.

Ethpalp. حَادْهَ اِنْدَهْ mutus factus est.

حَكْمَهْ , pl. حَكْمَهْ capistrum, camus ; in plur. tumores oris.

حَلَّهْ اِنْدَهْ , حَكْهَ , حَكْهَ اِنْدَهْ pl. , etc., et حَكْهَ اِنْدَهْ , m. βαλανεῖον, balneum.

حَكْهَ balneator.

حَكْهَ distortus pede.

حَدَّمَا pyxis aromatica.

حَدَّمَا , fut. حَتَّى aedificavit ;
trop. ad virtutis praxim excitavit, composuit carmina, etc.
Ethpe. حَاتِّا pass.

Pa. حَاتِّا aedificavit, speciat. in sensu metaphor. i.e. adhortatus est, exemplo juvit, animum erexit. حَدَّمَا كُحْرُونَ ne tim meas.

Ethpa. حَاتِّا pass.; it. consolationem, aedificationem percepit.

حَسْنَا aedificatio.

حَسْنَا et حَسْنَةً aedificator.

حَسْنَةً ars aedificandi.

حَسْنَةً , حَسْنَةً aedificatio, aedificium.

حَسْنَةً , f. حَسْنَةً aedificator. حَسْنَةً , f. حَسْنَةً , videlicet s. حَسْنَةً .

حَسْنَةً , pl. حَسْنَاتٍ rel. حَسْنَةً et حَسْنَاتٍ balneum.

حَسْنَةً βανάριος, balneator, f. حَسْنَةً

حَسْنَةً officium balneatoris. حَسْنَةً f. vexillum; cfr. βάνδων, et pers. بَنْد.

حَسْنَةً , fut. حَسْنَةً sprevit. :
cfr. حَنَّ.

Ethpe. حَاتِّا pass.

Pa. حَسْنَةً id. q. *Peal*.

Ethpa. حَاتِّا spretus est.

Aph. حَاتِّا sprevit, neglexit, reprobavit.

حَسْنَةً , حَسْنَةً part. pass. *Peal* — it. adj. vilis.

حَسْنَةً cum contemptu, negligenter, leviter.

حَسْنَةً , حَسْنَةً contemptio, negligentia, vilitas,
et حَسْنَةً حَسْنَةً .

حَسْنَةً intemperantia.

حَسْنَةً contemptor.

حَسْنَةً , vide حَسْنَةً .

حَسْنَةً contemptibilis.

حَسْنَةً , fut. حَسْنَةً suavis fuit, gratus fuit, gavisus est; denom. a حَسْنَةً suffivit.

Pa. حَسْنَةً suavem, gratum fecit, delectavit, exhilaravit; denomin. condivit, unxit.

حَسْنَةً حَسْنَةً امْهَنَةً suaves psalmos edens David.

Ethpa. حَاتِّا delectatus est, laetus est, fruitus est.

Aph. حَاتِّا suavem dedit odorem.

حَسْنَةً aroma, thus, pl. حَسْنَاتٍ et حَسْنَاتٍ حَسْنَةً ; حَسْنَاتٍ حَسْنَةً thuribulum.

حَسْنَةً jucunditas, delectatio, convivium; it. unguentum.

حَسَنٌ	aromaticus.	Ethpe. حَسَنٌ spretus est.
حَسَنًا, f.	unguentarius.	Pa. حَسَنٌ, sprevit, cohibuit, ausus est; حَسَنًا, part. act. et pass.— it. v. denomin., vide infra; حَسَنًا.
حَسَنًا	ars unguentarii.	Ethpa. حَسَنٌ contemptus est; it. denomin., vide infra حَسَنًا.
حَسَنًا	jucunditas, felicitas, fruitio, voluptas, convivium.	حَسَنٌ et حَسَنًا contemptio.
حَسَنًا	suavis; osyris planta.	id. حَسَنًا confutatio.
حَسَنًا	suavis, jucundus, mitis, benignus.	حَسَنٌ contemptor.
حَسَنًا	jucunde, temperate, libenter.	حَسَنٌ despectio.
حَسَنًا	suavitas, benignitas, laetitia.	حَسَنٌ contemptor.
حَسَنًا	aromata parans.	حَسَنٌ et حَسَنًا. contemptus.
حَسَنًا	gaudens, delicians.	حَسَنٌ ar. بَشَرٌ, pl. حَسَنٌ, uvæ acidæ, fructus immaturi.
حَسَنٌ	et حَسَنٌ, compos.	حَسَنٌ et حَسَنًا. caro, corpus; trop. homo, status ejus corruptus;
per contr. a	حَسَنٌ, plur.	حَسَنٌ homo; in carnibus rebus; حَسَنٌ مَوْتٌ mors carnis; c. aff. حَسَنٌ, حَسَنٌ, حَسَنٌ caro mea, etc. et per extens. ego, tu etc. - pl. حَسَنٌ pelles, carnes victimarum.
حَسَنًا	pulvinar, cervical.	حَسَنٌ v. denom. carnem cepit.
حَسَنٌ	talentum auri vel argenti.	Ethpa. حَسَنٌ incarnatus est.
حَسَنٌ	, pro frequentiori حَسَنٌ, prædatus est.	حَسَنٌ et حَسَنًا carnalis, corporalis, carnosus.
Palp.	حَسَنٌ laceravit, dilaniavit; trop. stupravit; part. pass. حَسَنٌ, حَسَنٌ; - trop. dissolutus.	حَسَنٌ carnaliter.
Ethpalp.	حَسَنٌ pass.	
حَسَنٌ	dilaniatio.	
حَسَنٌ	f. βάσις, basis.	
حَسَنٌ	, fut. حَسَنٌ sprevit, c. acc. vel حَسَنٌ, حَسَنٌ pers. vel rei; arguit, condemnavit.	

حَدَّةٌ، حَدَّةٌ، حَدَّةٌ incarnatio, generatio carnis.

لَهُمْ حَدَّةٌ et لَهُمْ حَدَّةٌ id.

حَدَّةٌ, pers. پستر posterior pars rei, tergum; -it. *præpos.* pone, post; c. *aff.* حَدَّهُ فَبْ حَدَّهُ فَبْ pone me, وَهُنَّا حَدَّهُ فَبْ pone eum, etc.; c. ۷. حَدَّهُ فَبْ حَدَّهُ فَبْ cecidit retrorsum. وَهُنَّا حَدَّهُ فَبْ retrorsum. وَهُنَّا حَدَّهُ فَبْ retroversus est.

حَدَّهُ فَبْ وَأَمْهَدَهُ فَبْ vel حَدَّهُ فَبْ retrorsum.

حَدَّهُ فَبْ et حَدَّهُ فَبْ posterior; حَدَّهُ فَبْ retrogradus.

حَدَّهُ فَبْ verb. denom. retro se vertit.

حَدَّا, fut. حَدَّا quæsivit, petiit, rogavit, expetiit, voluit; it. inquisivit, disputavit.

Ethpe. احْتَلَ pass. ; *impers.* requisitum, necessarium est; مَحَدَّداً part. ; *impers.* requisitum, res necessaria; opus est.

حَدَّهُ فَبْ pl. حَدَّهُ فَبْ petitio, oratio, deprecatio. حَدَّهُ cum oratione : precor, obseero.

حَدَّهُ مَأْتِي deprecatorius.

حَدَّهُ مَأْتِي qui querit, inquirit, scrutatur.

حَدَّهُ مَأْتِي expetens, deprecator, scrutator,

حَدَّهُ مَأْتِي precatio.

حَدَّهُ pl. حَدَّهُ inquisitio, scrutatio, disputatio, quæstio, petitio.

حَدَّهُ f. emph. حَدَّهُ pl. مَحَدَّهُ مَأْتِي quæsitus, necessarius.

حَدَّ - *Aph.* احْتَلَ removit; intr. destitit, recessit.

حَدَّهُ distantia, longinquitas.

حَدَّهُ فَبْ et حَدَّهُ فَبْ id. — it. peregrinatio.

حَدَّهُ , vide حَدَّهُ .

حَدَّهُ , cfr. בָּזָבְדָה . Exstat. in part. Ethpalp. حَدَّهُ ebullire faciens.

حَدَّهُ حَدَّهُ pl. حَدَّهُ حَدَّهُ bulla aquæ innatans, tumor.

حَدَّهُ pilus camelinus.

حَدَّهُ فَبْ f. fructus immaturus, acerbus.

حَدَّهُ, fut. احْتَلَ percussit spec. calce, calcitravit; calcavit.

Ethpe. احْتَلَ pass.

<i>Pa.</i> حَدَّ violenter calcavit.	حَدَّا مُلْحِدا consiliarius.
<i>Ethpa.</i> أَنْادَهُ pass.	حَدَّا مُنْفَدَا confederatus.
حَدَّا calcitratio, lucta.	حَدَّا اسْتَهْمَا confinis.
أَنْادَهُ حَدَّا calcitratio ; - <i>it. adj.</i> calcitrosus.	حَدَّا حَدَّا inimicus, adversarius.
حَدَّا ictus, plaga.	حَدَّا حَدَّا inimicitia.
أَنْادَهُ حَدَّا calcitratio.	أَنْادَهُ حَدَّا v. <i>denom.</i> hostis fac-
أَنْادَهُ حَدَّا , f. حَدَّانِيَةً calcitro-	tus est.
sus.	حَدَّا مُنْ
حَدَّ - <i>Idem est in derivat.</i>	, ex حَدَّ et مُنْ ,
quod حَدَّ , أَنْادَهُ .	adversarius.
حَدَّا conculeatus, pollutus,	حَدَّا بِأَدْخَلَ يَرْ verb. <i>denom.</i> litem
vilis ; <i>it.</i> raucus.	habuit.
حَدَّا , fut. نُحْمَى nupsit,	حَدَّا , fut. نُحْمَى dilania-
in uxorem duxit, c. acc. vel	vit ; calcitravit.
حَدَّا pers. ; virginem violavit.	<i>Pa.</i> حَدَّا convulsionibus dis-
Part. pass. حَدَّا nuptus, ma-	cerpsit, prostravit.
ritatus.	<i>Ethpa.</i> أَنْادَهُ pass.
<i>Ethpe.</i> حَدَّا maritus est.	حَدَّا et حَدَّانِيَةً calcitratio,
حَدَّانِيَةً uxoris conditio, conju-	volutatio in terram et con-
gium.	vulsiones.
حَدَّانِيَةً , حَدَّانِيَةً status mariti.	حَدَّا , fut. نُحْمَى exploravit ;
حَدَّا , حَدَّا dominus, maritus ;	it. <i>denomin.</i> ferus factus est.
possessor, particeps, prædi-	<i>Pa.</i> حَدَّا collegit, racemavit,
tus, obnoxius. c. aff. حَدَّ .	inquisivit ; <i>trop.</i> abolevit.
حَدَّا maritus.	<i>Ethpa.</i> أَنْادَهُ pass.
حَدَّا حَدَّانِيَةً depositarius.	حَدَّانِيَةً racematio, spicilegium.
حَدَّا وَافِي حَدَّا et	حَدَّانِيَةً , stereus quadrupedum.
sæpius حَدَّا aut حَدَّا inimicus, adversarius, lucta-	حَدَّانِيَةً part. pass. Pe. — it. subst.
tor.	coll. f. pecus, jumentum.
	حَدَّانِيَةً more brutorum.

حُرْفَةٌ et حُرْفَاتٌ animalis,
bestialis.

حُرْفَةٌ bestialitas.

حُرْفَةٌ inurbanitas.

Pal. حُرْفَةٌ ferum, ferocem redidit.

Ethpal. حُرْفَةٌ efferatus est, ferox vel rebellis factus est, aestuavit *ira vel libidine*.

حُرْفَةٌ ferus, brutus, immannis, furens.

حُرْفَةٌ ferociter.

حُرْفَاتٌ feritas, ferocitas.

حُرْفَاتٌ bestialitas, feritas.

حُرْفَهٌ , fut. حُرْفَهٌ timuit ; terruit ; cfr. ar. بَعْتَ .

Aph. حُرْفَهٌ terruit.

حُرْفَهٌ terror, improvisus impetus ; it. calcitratio, ictus, pro حُرْفَهٌ .

حُرْفَهٌ , vide حُرْفَهٌ , vel rad. حُرْفَهٌ .

حُرْفَهٌ , fut. حُرْفَهٌ inquisivit, consideravit, scrutatus est, exploravit, probavit.

Ethpe. حُرْفَهٌ pass. - it. scrutatus est.

Pa. حُرْفَهٌ sicut *Peal*.

Aph. حُرْفَهٌ id.

حُرْفَهٌ investigator, scrutator ; tutor.

حُرْفَهٌ et حُرْفَاتٌ investigatio.

حُرْفَهٌ et حُرْفَاتٌ id.

حُرْفَهٌ f., pl. حُرْفَاتٌ investigatio, quæstio.

حُرْفَهٌ inquirens.

حُرْفَهٌ حُرْفَاتٌ scrutabilis.

حُرْفَهٌ vel حُرْفَهٌ, cfr. حُرْفَهٌ بَصَلٌ , cæpa.

حُرْفَهٌ - *Ethpa.* حُرْفَهٌ macer fuit, extenuatus fuit.

حُرْفَهٌ macer, extenuatus, infirmus.

حُرْفَهٌ حُرْفَهٌ macilentia.

حُرْفَهٌ , fut. حُرْفَهٌ et حُرْفَهٌ decerpsit, detraxit, imminuit ; defecit, minor fuit ; reflex. se subtraxit, c. مُ .

Ethpe. حُرْفَهٌ pass.

Pa. حُرْفَهٌ minuit, abbreviavit, omisit, parvipendit ; inferior fuit, c. حُرْفَهٌ مُ ; حُرْفَهٌ inferior fuit.

Ethpa. حُرْفَهٌ pass. - it. ut *Peal* in sensu intrans.

حُرْفَهٌ defectus, particula ; digitus annularius.

حُرْفَهٌ sectator.

حُرْفَهٌ loca subterranea, aquæ conditoria.

حُرْفَهٌ , حُرْفَهٌ defectus, erratum, culpa ; حُرْفَهٌ وَلَا حُرْفَهٌ vel c. o, حُرْفَهٌ , nec plus nec minus.

حُمَّا part. pass. *Peal* ;
sed adject. *usurpat.* diminutus, imperfectus, deficiens ;
cum حُمَّا, minor, inferior ; minimus, parvus, paucus, vilis, plebeius. **دُوْمَنْ** adverbial. minus ;
مَهْمَنْ, it. **أَهْ حُمَّا**, **مَهْمَنْ** **حُمَّا**, plus vel minus, circiter :
حُمَّا مَكْلَا fere, circiter.

حُمَّا مَهْ minus.

حُمَّا مَلَمَّا *parvitas, paucitas, defectus, vilitas, humilitas* ;
حُمَّا مَلَمَّا, *parvitas gulw*, i. e. sobrietas ; **حُمَّا مَهْمَنْ** *parvitas oris*, i. e. modestia in loquendo.

حُمَّا مَلَمَّا *vilis, exiguis.*

حُمَّا مَلَمَّا *minuens.*

حُمَّا مَلَمَّا *defectus.*

حُمَّا مَلَمَّا *imminutioni obnoxius.*

حُمَّا, fut. **حُمَّا** *exploravit, probavit, tentavit.*

Ethpe. **أَدَمَّ** *pass.*

Pa. **حُمَّا** *examinavit.*

Ethpa. **أَدَمَّ** *probatus est. it. consideravit, cum preap.* **حُمَّا** *exploratio, probatio, experientia.*

حُمَّا *id.*

حُمَّا *et حُمَّا* *id.*

حُمَّا *consideratio.*

حُمَّا. fut. **تَحْمِمَ** *erosus est, putruit.*

Aph. **أَدَمَّ** *erosit, corruptit.*

حُمَّا *culex.*

حُمَّا *et حُمَّا* **حُمَّمَة** *erosio, corruptio.*

حُمَّمَه *ebullivit.*

حُمَّه *vitiligo* ; cfr. **مَهْمَه** et ar. **بَقْنَ**.

حُمَّه ar. **بَقْلَ**, qui olera vendit.

حُمَّه, fut. **تَحْمِمَه** ; *investigavit, inquisivit.*

Ethpe. **أَدَمَّ** *pass.*

Pa. **حُمَّه** *ut Peal.*

Ethpa. **أَدَمَّ** *pass.*

حُمَّه *et حُمَّه* **حُمَّه** *inquisitio, visitatio.*

حُمَّه *coll. grex. spec. boum - it. bos; pl. حُمَّه* *boves.*

حُمَّه *bubulcus.*

حُمَّه *gregatim.*

حُمَّه *gregarius.*

حُمَّه et derivata v. sub حُمَّه .

حُمَّه . دَهْتَه . pl. حُمَّه , حُمَّه .

st. c. دَهْتَه , filius ; f. حُمَّه .

pl. حُمَّه . حُمَّه .

st. c. حُمَّه filia ; c. aff. حُمَّه .

دَهْتَه , دَهْتَه , filius ejus,

tuus, noster; **خُنْسٌ** filius
meus, **خُنْدُمٌ** filius vester,
خُنْجُونٌ filius eorum; **خُنْبَابٌ**
filia tua, **خُنْبَاتٌ** filia ejus,
خُنْبَانٌ filia mea. **خَ** varie
adhibetur cum nomin. quae si-
gnificant etatem, tempus, con-
nectionem quamcumque: ex.
g. **خَ** **أَهْمَدٌ** eamdem
artem exereens. **خَ** **إِلَيْهِ** indi-
gena. **خَ** **جَنْتَانٌ** cognatus.
خَ **نَهْدَى** in ipso die vel
statim; **خَ** **فَتَّانٌ** consubstan-
tialis. **خَ** **سَوْرَةٌ** conjux.
خَ **حَلْمَانٌ** laicus.
خَ **مَحْدَثٌ** septem-
annos natus, **خَ** **مَعْدُواً** ante-
murale.

μόν *dim.* filiolus.

Ethpe. اَنْادِيْنَ, *rel.* اَنْدِيْنَ *verb.*
denom. filius factus est.

Ethpa. ﴿۲۷﴾ id.

Loṭṭah et **Loṭṭah** filii status,
filiatio.

filius hominis :
 homo ; pl. حَمِيمٌ ; f. حَمِيمَةٌ ;
 in st. c. حَمِيمٌ , pl. حَمِيمٌ , in st. c.
 حَمِيمٌ filiae civium
 paqī : mulieres.

جذب الهمم

لَعْنَدْ homuncio.

Wise incarnation

لَاحِنَّ *verb. denom. incarnatus est.*

الْمَهْدَىُّ الْمَسْعُودُ incarnatio.

حَنَّا, fut. **حَنْتُمَا**, cf. **حَنِّي**, crea-
vit; **حَنْتُمَا**, part. act. — it.
substant., f. emph. **حُنْتُمَا**,
pl. **حَنَّتُمَا**, creator, creatrix;
حَنَّا, part. pass. — it.
substant. pl. m. emphat. **لَهُنَّتُمَا**,
f. pl. emph. **أَنْتُمْ حَنَّتُمَا**, creatus,
res creata; *ride etiam infra*
حَنَّةً:

Ethpe. **וְשָׁלֵךְ** pass.

خَلَقَهُمَا, *f.* **خَلَقَهُمَا**, *pl.* **خَلَقَهُمَا**.
creator, *c. aff.* **خَلَقَهُمَا**, *c.* **خَلَقَهُمَا**.
خَلَقَهُمَا potentia creativa,
creatio.

creative

|لوه و لام creatio.

¶ ad creatorem pertinens.

خَلْقٌ, part. pass. Peal. f. emph; substant. pl. **خَلْقٌ** creatio, creatura, mundus, homines.

جُنْدَنْ مُدَبِّر creabilis.

|Loֹתָה, pl. |Loֹתָה abies, cypres-
sus; scobs.

الْمُهْدَّدَةُ creatio, creabilitas.

لُجْنَى بَرْبَارُسَ، *barbarus*.

Nicotiana barbare

L. i. et L. i. vide L. i.

hinc diminut. vocis hinc

lís variegatus.

Pa. حَتْ ostendit.

Aph. حَتْ manifestavit.

Ettaph. حَاتِنْ pass.

حَنْرَا, ar. حَنْرَص, lepra.

لَوْجَةَ scabies.

حَنْرَا perforatio, manifestatio.

مَحْنَوْمَهُ manifeste.

حَنْنَهُ, fut. مَهْنَهُ fulsit,
splenduit, obtusus fuit *dens* ;
part. act. حَنْنَهُ — *it. substantive*

smaragdus ; cfr. *etiam* لَعْنَهُ.

Aph. فَأَهْنَلَ fulgere, fulgura-
emittere fecit.

Ettaph. مَهْنَلَنِي fulsit, fulgura-
vit, coruseavit.

حَهْنَهُ hebetati *dentes*.

حَهْنَهُ hebetudo *dentium* ; pustu-
la, uleus.

حَهْنَهُ fulgur.

حَهْنَهُ smaragdus.

حَهْنَهُ fulmineus.

حَهْنَهُ divinator, incantator.

حَهْنَهُ canalis, vadum.

حَهْنَهُ armeniacum prunum,
malus armeniaca.

حَهْنَهُ — *vix usitat. praeter*
partic. pass. حَهْنَهُ, حَهْنَهُ,
incultus, simplex, rudis; inno-
cens, purus ; cfr. حَهْنَهُ, حَهْنَهُ et
infra حَهْنَهُ.

حَهْنَهُ simpliciter.

الْهَمْنَهُ simplicitas.

حَهْنَهُ, cfr. حَهْنَهُ, terra inculta,
desertum, ager ; quod extra
est, pars externa ; f. emph.
الْهَمْنَهُ, pl. الْهَمْنَهُ ; c. حَهْنَهُ
extra, foras ; وَلَهْنَهُ, qui
extra est, externus, extra-
neus ; حَهْنَهُ ab extra ;
حَهْنَهُ, extra, foris,
ultra, praeter, absque ; حَهْنَهُ
perpetuo.

Pa. حَهْنَهُ, verb. denomin. ex
حَهْنَهُ, extra posuit, removit ;
purifieavit ; حَهْنَهُ, حَهْنَهُ
part. pass. exclusus, remotus,
immunis.

Ethpa. حَاهْنَلَنِي pass. - *it. se re-*
movit, exiit.

حَاهْنَهُ exterior.

حَاهْنَهُ exterior, extraneus,
extrinsecus, remotus, agrestis ;
trop. profanus, ethnicus ; lit-
teralis *sensus*.

حَاهْنَهُ externe.

حَاهْنَهُ sanctitas, puritas ; dis-
tantia.

حَاهْنَهُ, pl. حَاهْنَهُ plateæ.

حَاهْنَهُ it. حَاهْنَهُ quod exteriorius
est, externa pars.

حَاهْنَهُ externe.

حَاهْنَهُ exterior pars, exterior-
itas.

حَاهْنَهُ remotio, abstractio.

حَنْوَأْ , st. c. حَنْوَأْ , pl. حَنْوَأْ , ovum ; it. vide حَنْوَأْ .

حَنْوَأْ fut. حَنْوَأْ maturuit ; coxit.

Ethpe. حَنْوَأْ pass.

Pa. حَنْوَأْ maturescere fecit, coxit.

Ethpa. حَنْوَأْ pass.

Aph. حَنْوَأْ maturescere fecit.

حَمْلَأْ edulium, res cocta, pul- mentum ; coctio, maturitas.

حَمْلَأْ maturitas ; racemus mat- turus.

حَمْلَأْ et حَمْكَهَا maturitas.

حَمْكَهَا coquere faciens.

حَمْلَأْ , vide حَمْلَأْ .

حَمْلَأْ , it. حَمْلَأْ , pl. حَمْلَأْ vas, dolium.

حَمْلَأْ m. abs., حَمْلَأْ m. emph. et f. abs., حَمْلَأْ , f. emph., pl. f. حَمْلَأْ , حَمْلَأْ , cælebs, virgo ; constellatio virginis ; it in pl. m. signa virginitatis : in f., etiam ovum.

حَمْلَأْ virginaliter.

حَمْلَأْ virginitas, cælibatus.

حَمْلَأْ virgineus.

Pa. حَمْلَأْ verb. denom. devirgi- navit, corrupit.

Ethpa. حَمْلَأْ pass.

حَمْلَأْ , vide حَمْلَأْ .



Q tertia littera alphabeti;
numerice **Q** vel **q̄** = 3,
Q vel **q̄** = 3000, **Q̄** =
30000, **q̄** = $\frac{1}{3}$; ubi
vero, præfigitur eadem sig-
na numer. ordin. exprimunt;
ex. gr. **Q̄**, tertius, etc.

L̄, fut. **L̄** vel melius
L̄, part. **L̄** vel melius
L̄, lætatus est.

Pa. **L̄** vel **L̄** fut. **L̄**
vel **L̄**, part. **L̄** vel
L̄, pl. m. **L̄** lactatus
est; c. **L** gloriatus est.

Aph. **L̄** superbum fecit.

Ethpa. **L̄**, vel **L̄**,
et **L̄**, **L̄**, glorifica-
tus est; jactavit se, super-
bivit; deliciatus est, c.
L rei; fulsitus, splenduit.

L̄, **L̄** decorus, excelsus,
majestate insignis; superbus;
pl. **L̄**; in fem. emph.
L̄, pl. **L̄**.

L̄ magnifice, splendide.
L̄ magnificentia, gloria,

splendor; superbia, fastus,
deliciae.

L̄ plerumque usitat. in
plur. **L̄** luxus, deli-
ciae.

L̄ et **L̄** superbus,
fastuose vivens.

L̄ vel **L̄** et
L̄; pl. **L̄**, volup-
tas, splendor, gloria.

L̄, vide **L̄**.

L̄, vide **L̄**.

L̄, vide **L̄**.

L̄, **L̄**, et dim. **L̄**,
vide sub rad. **L̄**.

L̄, fut. **L̄**, elegit,
collegit, exegit tributum, ar-
cavit; it. mundavit, probavit.
Infin. **L̄**. Part. act. **L̄**,
f. **L̄**; pl. m. **L̄**, f.
L̄; Part. pass. **L̄**,
L̄; pl. **L̄**, **L̄**;
f. emph. **L̄**, pl. **L̄**,
L̄, electus, probatus,
eximus; c. aff. 1^o. p. **L̄**,
vel **L̄**, it. **L̄** elec-

tus meus, **جَتْ** *vel* **جَتْ** electi mei; **جَتْمِي**, electi ejus, etc.; *Impers.* **جَحْمَنْ** tibi placet; **جَحْمَنْ** كُفْ مُنْ tibi gratior est quam

Ethpe. **جَحْلَى** *pass.*

Pa. **جَحْلَى** *sicut Peal.*

Ethpa. **جَحْلَى** collectus est.

Aph. **جَحْلَى** elegit; exactorem constituit; **أَجَحْلَى** نَفْعَهُ se devovit.

جَحْلَى custos carceris.

جَحْلَى electio.

جَحْلَى exactor.

جَحْلَى electe.

جَحْلَى electio; **جَحْلَى** persona tua electa.

جَحْلَى electio, selectio, collectio; *pl.* **جَحْلَاتْ** collectæ, eleemosynæ.

جَحْلَى electio, selectio; munatio.

جَحْلَى *in usit.* — *cfr. ar.* **جَبَّ** secuit, fudit; *et* **قَبْ** fornice instruxit.

جَحْلَى gibbosus.

جَحْلَى, *ar.* **جَهْمَةُ**, puteus, cisterna, fovea, carcer subterraneus; hydria.

جَحْلَاتْ, *pl.* **جَهْمَاتْ** fovea, caverna, arundo cava qua lucernæ extinguntur.

جَحْدَى fornix, opus concamera-tum; lupanar.

جَحْدَى calvus.

جَحْدَمَا calvities.

جَحْلَى, *fut.* **جَحْلَى** finxit, formavit; composuit.

Ethpe. **جَحْلَى** *pass.*

Pa. **جَحْلَى** fortiter formavit.

Ettaph. **جَحْلَى** *ut Ethpe.*

جَحْلَمَا, *f.* **جَحْلَمَا** fictio, formatio.

جَحْلَمَا *id.*

جَحْلَمَا fictio, fabula.

جَحْلَمَا formator, creator; figulus.

جَحْلَمَا plasticie.

جَحْلَمَا ars figuli, plasmatoris.

جَحْلَمَا, *f. emph.* **جَحْلَمَا**, *part. pass.* *Peal.* — *it. substant.* : in masc. nomen actionis *apud grammatis*; in fem. figuratum, massa; formatio; *it. gram.* littera quæ pronuntiatur quamvis non scribatur.

جَحْلَمَا fictio, formatio; *trop.* simulatio.

جَحْلَمَا creabilis, formabilis.

جَحْلَمَا *ut Pa. q. usitatius est.*

Ethpe. **جَحْلَمَا** coagulatus est.

Pa. **جَحْلَمَا** coagulavit.

Ethpa. حَنْدَلٌ pass.

حَنْدَلٌ et حَنْدَلٌ forma in qua conficitur caseus.

حَنْدَلٌ, et usitatus حَنْدَلٌ caseus.

حَنْدَلٌ, cfr. ar. جِنْ, caseus; massa compacta.

حَنْدَلٌ coagulatio; stupor.

حَنْدَلٌ supercilium, cacumen: trop. superbia حَنْدَلٌ frons; cfr. ar. جَبِينٌ.

حَنْدَلٌ et حَنْدَلٌ مَوْهَنٌ cacumina habens mons.

حَنْدَلٌ, pl. حَنْدَلٌ placenta.

حَنْدَلٌ, fut. حَنْدَلٌ violenter tractavit, coercuit.

حَنْدَلٌ, vir, homo, maritus; unusquisque; حَنْدَلٌ, f. virago; حَنْدَلٌ حَنْدَلٌ vel حَنْدَلٌ singuli; حَنْدَلٌ وَسَفَرٌ commensales tui; حَنْدَلٌ وَمَقْدِسٌ vir statura magnus; حَنْدَلٌ حَنْدَلٌ vir effeminatus; حَنْدَلٌ وَمَقْدِسٌ, socii, confederati tui.

حَنْدَلٌ et حَنْدَلٌ حَنْدَلٌ dimin. homuncio, homunculus.

حَنْدَلٌ, pl. حَنْدَلٌ, virilitas, fortitudo: concr. homines, virilia; in pl. mirabilia.

حَنْدَلٌ virilis; f. emph. حَنْدَلٌ, pl. حَنْدَلٌ.

حَنْدَلٌ id.

حَنْدَلٌ, ar. جَيَارٌ, heros, gigas; Orion constellatio; -adject. fortis, potens, magnus, excellens, c. حَنْدَلٌ سَلْلٌ; حَنْدَلٌ, heroes; حَنْدَلٌ f. domina, heroïna; fortis, excellens.

حَنْدَلٌ viriliter, fortiter.

حَنْدَلٌ, pl. حَنْدَلٌ virilitas, fortitudo, potentia, robur.

حَنْدَلٌ verb. denom. a حَنْدَلٌ, vir factus est, virilem animum addidit, corroboravit.

Ethpa. حَنْدَلٌ vir factus est; fortiter se gessit, prævaluit, vicit, c. حَنْدَلٌ; prospere se habuit res.

حَنْدَلٌ verb. denom. a حَنْدَلٌ, robustus factus est, viriliter se gessit; superbivit.

حَنْدَلٌ virilis.

حَنْدَلٌ caseus.

حَنْدَلٌ, f. حَنْدَلَةٌ, scortator, meretrix.

حَنْدَلٌ, vide حَنْدَلٌ.

حَنْدَلٌ, et deriv. vide حَنْدَلٌ.

حَنْدَلٌ, imper. verbi حَنْدَلٌ.

حَنْدَلٌ, fut. حَنْدَلٌ et حَنْدَلٌ abscedit; texuit.

Ethpe. حَنْدَلٌ abscissus est.

<i>Ethpa.</i> <i>id.</i>	<i>Ethpe.</i> <i>plexus est,</i> <i>flexus est : sibi plexit.</i>
<i>licium, stamen.</i>	
<i>pl.</i> <i>cfr.</i>	<i>Pa.</i> <i>nexuit.</i>
<i>fortuna, numen Fortunae ;</i>	<i>Aph.</i> <i>id. ac. Pe ; corona-</i>
<i>fortunatus :</i>	<i>navit.</i>
<i>infelix ;</i>	<i>Ethpan.</i> <i>cumulatus</i>
<i>templum Fortunae ;</i>	<i>est.</i>
<i>fortunatus.</i>	<i>quidquid nexum, plicatum</i>
<i>fortuna, felicitas.</i>	<i>est, corona : implicatio-</i>
<i>juvenis exsors</i>	<i>pl.</i> <i>implicatio-</i>
<i>matrimonii, innuptus.</i>	<i>crinium, ipsi crines plexi, cincin-</i>
<i>vita cælebs.</i>	<i>nus, torques.</i>
<i>c. cœtus, turma,</i>	<i>ars texendi.</i>
<i>agmen militum, chorus ; cfr.</i>	<i>p. act. Peal ;</i>
<i>et</i> <i>. جند</i>	<i>part. pass. Peal : — it.</i>
<i>turmatim ; it. vallum.</i>	<i>subst., præsent. infem.</i>
<i>c. sine singul.,</i>	<i>pl.</i> <i>opus tortile,</i>
<i>absinthium, colocynthis; trop.</i>	<i>catenatum, torques : crines</i>
<i>amaritudines, molestiae.</i>	<i>plexi, cineinni ; peniculamenta</i>
<i>amarus.</i>	<i>fimbriarum :</i>
<i>fut.</i> <i>ascendit ;</i>	<i>et</i> <i>myrtus.</i>
<i>sursum jecit.</i>	<i>et</i> <i>rete.</i>
<i>ascensus.</i>	<i>turris, arx :</i>
<i>pl.</i> <i>hœdus ;</i>	<i>turris carnis :</i>
<i>Capricornus, signum Zodia-</i>	<i>elephas.</i>
<i>ci.</i>	
<i>dimin.</i> <i>hœdulus.</i>	
<i>fut.</i> <i>contor-</i>	<i>fut.</i> <i>abscidit,</i>
<i>sit, plexit, flexit, nexuit ; vo-</i>	<i>confregit : circumcidit.</i>
<i>lavavit, ascendit.</i>	<i>Ethp^o.</i> <i>pass. — it. grau.</i>
	<i>apocope affecta est vox.</i>
	<i>Pa.</i> <i>ut Peal.</i>
	<i>Ethpa.</i> <i>id. q. Ethpe.</i>
	<i>ramus, spec.</i>

ramus palmae abscissus ; abscissio, apocope, *quam Arabes vocant*. جَزْمٌ.

هَبْهَمٌ seindens, confringens.

هَوْهَمٌ caesio, scissio.

هَبْهَمٌ fut. هَبْهَمٌ amputavit.

هَبْهَمٌ, pl. هَبْهَمٌ margo lapius, contractura, prominentia muri, montis, etc.

هَبْهَمٌ - Pa. هَبْهَمٌ blasphemavit, conviciis affecit.

Ethpa. هَبْهَمٌ pass.

هَبْهَمٌ blasphemia; it remigatio. ar. قَذْفٌ.

هَبْهَمٌ remes.

هَبْهَمٌ blasphemator; remus. هَبْهَمٌ blasphemia, convicium, maledictio.

هَبْهَمٌ, هَبْهَمٌ blasphemus.

هَبْهَمٌ blasphemia.

هَبْهَمٌ et هَبْهَمٌ, ar. غَدِير, stagnum.

هَبْهَمٌ lentes.

هَبْهَمٌ piscis genus.

هَبْهَمٌ, fut. هَبْهَمٌ coacervavit, ar. كَدَسَ et كَدَسَ; - it. contigit, evenit, c. acc. rel. p.; impers., هَبْهَمٌ, rel. o... هَبْهَمٌ contigit quod.

هَبْهَمٌ part. pres. accidens, id quod evenit, eveniet: adverb. هَبْهَمٌ vel

هَبْهَمٌ forsitan, aliquando; هَبْهَمٌ part. pass.; it. acerbus; - adj. fortuitus.

هَبْهَمٌ accidens, casus; it. ut هَبْهَمٌ vel هَبْهَمٌ et هَبْهَمٌ casu. هَبْهَمٌ casu.

هَبْهَمٌ, f. هَبْهَمٌ casu accidentis, adventitius.

لَهْلَهٌ, fut. لَهْلَهٌ evasit, liberatus est, quievit a; trop. mortuus est.

Ethpe. لَهْلَهٌ liberatus est.

Pa. لَهْلَهٌ exstinctus est.

Aph. لَهْلَهٌ nt Peal; it. liberavit.

لَهْلَهٌ et لَهْلَهٌ effugium, fuga, liberatio; trop. mors.

لَهْلَهٌ liberans.

لَهْلَهٌ liberatio, fuga.

لَهْلَهٌ, pers. لَهْلَهٌ, tempus, momentum.

لَهْلَهٌ illuxit; cf. لَهْلَهٌ.

لَهْلَهٌ aurora.

لَهْلَهٌ pubescens; libidinosus, salax.

لَهْلَهٌ pubertas; libido, satiitas.

لَهْلَهٌ et لَهْلَهٌ, fut. لَهْلَهٌ procubuit. Part. pass. لَهْلَهٌ,

inclinatus, procumbens.

Ethpe. حَلَّ se inclinavit ;
in genua procidit.

Pa. حَلَّ ut *Peal.*

Aph. حَلَّ procumbere fecit.

لِّيْلَةُ وَلِّيْلَاتُ , pl. لِّيْلَاتٍ
inclinatio ; inclinatio cum
oratione secreta.

لِّيْلَةُ وَلِّيْلَاتُ , cfr. גַּר הַנְּבָא ,
γέεννα, gehenna ; pl. لِّيْلَاتٍ
et لِّيْلَاتٍ .

لِّيْلَةُ , fut. لِّيْلَى caligavit
oculus ; trop. obstupuit. Part.
præs. لِّيْلَى , لِّيْلَى . Part.
præterit. لِّيْلَى caligans,
caligine perstrictus, cœcus.

Aph. لِّيْلَى obfuscavit, obscuravit.

لِّيْلَةُ albuginem habens in
oculo ; trop. orbatus, c. مَوْ .

لِّيْلَةُ caligatio ; it. hebes
oculis.

لِّيْلَاتُ hebetudo oculorum.

لِّيْلَاتُ caligans.

لِّيْلَاتُ et لِّيْلَاتُ caligatio.

لِّيْلَاتُ , لِّيْلَاتُ pars interior,
pars intima; medium, viscera;
it. *in statu emph.* communitas, universitas, vulgus ;

لِّيْلَاتُ , qui intus, interior est,

qui communis, universus est;

c. præpos. intus, intra : حَلَّهُمَا intra domum,
حَلَّهُمَا id. ; حَلَّهُمَا مِنْ حَلَّهُمَا
intus, intrinsecus, ab intra.
لِّيْلَاتُ , simul.

لِّيْلَاتُ - لِّيْلَاتُ verb. denom.
introduced, immisit ; مَنْعِمَةُ ,
مَنْعِمَةُ part. pass. introductus,
introrsum situs, ulterior; trop. versatus in re,
particeps secreti, a secretis ;
initiatus.

Ethpa. لِّيْلَاتُ v. denom.
se introduxit, penetravit ;
كَفَرَ لِّيْلَاتُ كَفَرَ familiarem se
fecit alicui, ex intimis ejus
fuit.

لِّيْلَاتُ , pl. لِّيْلَاتٍ , emph.
لِّيْلَاتُ , f. لِّيْلَاتُ , pl. لِّيْلَاتٍ ,
لِّيْلَاتُ , qui intra est, internus, interior ; incola ; in pl.
emph. cives ; domestici, per
oppos. ad مَنْعِمَةً .

لِّيْلَاتُ , pl. لِّيْلَاتٍ viscera ; it.
castratus.

لِّيْلَاتُ , pila, globus ; pl.
لِّيْلَاتُ haemorrhoides.

لِّيْلَاتُ pars intima rei, pen-
trale ; possessio.

لِّيْلَاتُ , لِّيْلَاتُ communis, uni-
versalis.

لِّيْلَاتُ communiter.

communitas.

pila lusoria.

أَجَابَ - Aph. أَجَابَ , ar. أَجَابَ , respondit ; trop. morrem gessit.

Ettaph. أَجَابَ لِلِّي pass.

et مُسْتَهْنَةً et مُسْتَهْنَةً responsum.
أَجَابَ . , أَجَابَ . , vide أَجَابَ .

أَوْهَنَ et أَوْهَنَ mussitatio.

أَوْهَنَ vagiens.

أَرَانِي , pl. تَفَتَّةٌ f. aranca ; tela araneæ.

أَوْهُوا f. uter aquarius.

أَوْهُوا sepes.

أَوْهُمْ equus nobilis, ar. جَوَادٌ .

أَوْهُوا , v. s. أَوْهُوا .

أَرَادَ , fut. أَرَادَ , infin. أَرَادَ , defecit, aruit; transiit, declinavit ; cfr. ar. جَازَ .

Pa. أَرَادَ deficere fecit, immuniuit, delevit; sterilis fuit ; cfr. أَرَادَ , أَرَادَ .

Ethpa. أَرَادَ لِي imminentus est, perditus est.

Aph. أَرَادَ orbavit, perdidit.

أَرَادَ et أَرَادَ defectus.

أَرَادَ , أَرَادَ et أَرَادَ nux arbor et fructus ; cfr. ar. جَوزٌ .

أَرَادَ , v. s. أَرَادَ .

أَرَادَ , fut. أَرَادَ erupit, effusus est ; germinavit.

Aph. أَرَادَ لِي erumpere, exundare fecit, aperuit.

Ettaph. أَرَادَ لِلِّي pass.

أَرَادَ , et أَرَادَ fragor terræ, tonitus ; terror, calamitas ; cfr. أَرَادَ .

أَرَادَ et أَرَادَ exundatio.

أَرَادَ et أَرَادَ inundatio, effusio.

أَرَادَ , fut. أَرَادَ commotus est ; exundavit ; cfr. rad.

أَرَادَ et ar. جَانَ circumivit ; it. misericordia motus est.

Ethpe. أَرَادَ لِي rejectus est.

Aph. أَرَادَ لِي rejicit.

Ettaph. أَرَادَ لِلِّي pass.

أَرَادَ , f., pl. أَرَادَ vestis qua corpus involvitur, spec. palium, cucullus.

أَرَادَ convolutio.

أَرَادَ rejectio, elatio.

أَرَادَ et أَرَادَ , أَرَادَ et أَرَادَ , gr. γαληνη et καλλιλεξ simia.

أَرَادَ , fut. أَرَادَ præscidit ; cfr. أَرَادَ .

أَرَادَ excisio.

أَرَادَ tonsor.

أَرَادَ ars tonsoris ; it. excisio.

وَهْ et وَهْ, vide s. وَهْ .
وَهْ γυμνάσιον gymna-
sium.

وَهْ et وَهْ, pl. وَهْ color;
modus; وَهْ varii colores; cfr. pers. وَهْ كون.
وَهْ sicut; itaque, ergo.

وَهْ verb. denom. coloravit.

Ethpa. وَهْ pass.

Ettaph. وَهْ id.

وَهْ coloratus.

وَهْ vas, pelvis, po-
culum; cfr. ar. جَزْنَة .
وَهْ , vide s. وَهْ .

وَهْ , f., emphat. وَهْ ;
pl. وَهْ , وَهْ , وَهْ ,
وَهْ , emph. وَهْ ;
et وَهْ , γωνία, angulus.

وَهْ - Inusit in Peal;
cfr. ar. حَاجَنَ diligenter quæ-
sivit, furacissime perscruta-
tus est.

Pa. وَهْ deprædatus est.

وَهْ , agmen, turma militum,
spec. prædonum; it. prædatio;
cf. ar. جَيْش exercitus.

وَهْ latro, prædo.

وَهْ ars prædandi.

وَهْ locus ad confugium

expetitus, profugium; وَهْ id.; وَهْ configuit
ad, c. وَهْ .

وَهْ id.

وَهْ verb. denom. refugium
habuit, configuit, c. وَهْ pers.

وَهْ et وَهْ configuiens ad,
profugus, fugitivus.

وَهْ levir.

وَهْ ohe. interj. contempt.

وَهْ f., pl. وَهْ racematio, spicilegium.

وَهْ , fut. وَهْ allexit,
rete venatus est, hausit, pro-
rupit.

Pa. وَهْ id.

Ethpa. وَهْ clausus est,
obseratus est.

وَهْ et وَهْ rete.

وَهْ , fut. وَهْ adulteratus
est, mœchatus est; part.
præs. وَهْ , f. وَهْ mœchans,
adulter.

Aph. وَهْ in adulterium ad-
duxit; adulteratus est.

Ethpa. وَهْ scortatus est;
cfr. وَهْ infra.

Ettaph. وَهْ id.

وَهْ adulterium; pagina,
columna libri.

مَلَّ, fut. **مَلِّى**, ar. جَزَمَ, incidit, decrevit; irruit in, adortus est, c. **كَ**; minatus est. *Impers.* كَمْلَى decretum est.

Ethpe. مَلِّى minis impetus est.

Pa. مَلَّ minatus est.

مَلَّا impetus, minæ, audacia.

مَلِّى comminatory.

مَلِّى ut مَلَّا.

مَلَّا virga decisa.

مَلَّ — *Inus. in Péal, cfr. ar. مَلَّ et جَدَّ* secuit.

Ethpa مَلِّى succisus est.

مَلَّا f., rarius m., truncus succisus, virga; radix, gramm.

مَلَّا radicalis, gramm.

مَلَّ, fut. مَلِّى secuit, laceravit; circumcidit, circumcisus est; statuit, decrevit.

Ethpe. مَلِّى pass.

Aph. مَلِّى paravit, dari decrevit, dedit.

مَلَّا sectio, abscissio, decretum; it. grex ovium, ovile, monasterium; مَلَّا وَمَلَّا vel مَلَّا وَمَلَّا, pl. مَلَّا وَمَلَّا sententia judiciaria.

مَلِّى circumcidens, lanius.

مَلِّى desectio, circumcisio.

مَلَّا, مَلَّا, f. emph.

مَلِّى part. pass.—it. subst. in fem. emph. decisio, sententia; area, septumve templi; insula; pinna muri; annulus portæ; segmenta ligni.

مَلَّا et مَلَّا, pers. مَلَّر, satelles, lictor.

مَلَّا per judicium, decretriae.

مَلَّا præda; dona sponsalia; incisio, amputatio.

مَلِّى ut مَلِّى.

مَلَّا, pl. مَلَّا, مَلَّا insula.

مَلَّا parva insula.

مَلَّا securis, scalprum, culter.

مَلَّا daucus staphylinus, ar. جَزَر (gall. carotte).

مَلَّا et مَلَّا, fut. مَلَّى, cfr. ar. مَلَّ et heb. מָלַל, risit, derisit, c. او aut مَلَّا pers., it. lusit.

Ethpe. مَلَّى pass.—it. derisit.

Pa. مَلَّا ut Péal.

Ethpa. مَلَّى pass.

Aph. مَلَّا ridere fecit.

مَلَّا risus.

مَلَّا risibilis.

مَلَّا ridens.

مَلَّا risor, f. حَمَدَة حَمَدَة.

رِسْتَنْ risum movens.

رِسْتَنْ, f. رِسْتَنْ risu dignus, ridiculous.

رِسْتَنْ, fut. رِسْتَنْ excrevit pituitam, etc.; rasit.

رِسْتَنْ hujusmodi excretio.

لَهْلَهْ, لَهْلَهْ et لَهْلَهْ uno testi culo destitutus, cfr. ar. لَهْلَهْ, et rabb. لَهْلَهْ; it. testamentum, haereditas.

لَهْلَهْ, vide لَهْلَهْ.

لَهْلَهْ, ride sub لَهْلَهْ.

لَهْلَهْ scoria argenti.

لَهْلَهْ, hebr. גִּיד, nervus, tendo; radix; chorda, ligamen; cfr. ar. قَنْ compes.

لَهْلَهْ verb. denom. nervos amputavit.

لَهْلَهْ pass; it. trucidatus est.

لَهْلَهْ nervous.

لَهْلَهْ, vide لَهْلَهْ.

لَهْلَهْ c. deriv., vide s. لَهْلَهْ.

لَهْلَهْ, vide s. لَهْلَهْ.

لَهْلَهْ et لَهْلَهْ, cfr. لَهْلَهْ.

لَهْلَهْ pars prominens tecti vel parietis.

لَهْلَهْ, pictura; cfr. لَهْلَهْ.

لَهْلَهْ viscus, gluten, ar. غَرْم.

يَارْ partic. postpos. et unq. expletiva: enim, nam, quidem, sed.

لَهْلَهْ, fut. لَهْلَهْ, infin. لَهْلَهْ, revelavit, detexit, patefecit, declaravit; rexit, operuit, mudavit; evulgavit librum: pronunciavit litteram; it. intrans., sed melius لَهْلَهْ, migravit, exsulavit; cfr. heb., נָבַל et ar. نَبَل. Part. act., لَهْلَهْ, لَهْلَهْ, f. emph. لَهْلَهْ; pl. m. emph. لَهْلَهْ, f. emph. لَهْلَهْ, exsul, captivus. Part. pass., لَهْلَهْ, لَهْلَهْ, f. emph. لَهْلَهْ; pl. m. لَهْلَهْ, f. لَهْلَهْ, لَهْلَهْ. — adject. manifestus, clarus, certus, evidens; لَهْلَهْ vel لَهْلَهْ evidens est; trop. لَهْلَهْ آفَتْ لَهْلَهْ aperti sunt vultus nostri, i.e. confidentes sumus; adverb. لَهْلَهْ مَعَ, vel لَهْلَهْ aperto, coram, confidenter; لَهْلَهْ مَعَ لَهْلَهْ palam, publice. Ethpe. لَهْلَهْ et forma redupl. لَهْلَهْ pass. لَهْلَهْ. Pa. لَهْلَهْ ut لَهْلَهْ et لَهْلَهْ; it. migrare fecit, in captivitatem duxit; vide infra لَهْلَهْ. مَعَ لَهْلَهْ et deriv. infin. مَعَ لَهْلَهْ. Part. act. مَعَ لَهْلَهْ f. مَعَ لَهْلَهْ; pl.

- جَهْمَةُ**, f. مَهْلَمْةُ .Part. pass. مَهْلَمْتُ .Part. pass. مَهْلَمْتُ , مَهْلَمْنَا , pl. مَهْلَمْنَى , f. مَهْلَمْتَ , emph. مَهْلَمْدَأ .
جَهْمَةُ حَبْمَةُ حَفْمَةُ اهْمَهْمَةُ retegite usque ad fundamenta ejus, i. e. funditus evertite.
- Ethpa.** لَكَّا لِ pass.
- Aph.** لَكَّا لِ, infin. مَهْلَمْنَى , part. act. مَهْلَمْنَى , part. pass. مَهْلَمْكَ , detexit, extraxit. مَهْلَمْلَأْ أَقْتَلَأْ id. q. لَكَّمَأْ أَقْتَلَأْ .
- جَهْمَةُ** revelatio, manifestatio; adverb, præc. و vel. لَكَّا , palam, publice.
- جَهْمَةُ** manifeste, palam, exterius.
- جَهْمَةُ** revelatio, detectio, manifestatio; لَكَّمَأْ أَقْتَلَأْ detectio faciei: fiducia.
- جَهْمَةُ** manifestans.
- جَهْمَةُ et جَهْمَةُ** revelatio, manifestatio, apparitio; transfiguratio Christi; declaratio.
- جَهْمَةُ** per visionem.
- جَهْمَةُ**, f. لَكَّمَأْ , ad visionem pertinens, visibilis, patens.
- جَهْمَةُ** tabula depolita ad scribendum, inde schedula, scriptum.
- جَهْمَةُ** captivitas; ipsi captivi.
- جَهْمَةُ** quasi denom. a præc., in captivitatem duxit. Part.
- جَهْمَةُ** act. مَهْلَمْمَأْ , مَهْلَمْمَأْ . Part. pass. مَهْلَمْمَأْ , مَهْلَمْمَأْ . Ethpa. لَكَّمَأْ لِ pass. captivum faciens. لَكَّمَأْ captivus, exsul, pl. لَكَّمَتَأْ captivitas, migratio: it. detectio, nudatio. مَهْلَمْمَأْ مَهْلَمْمَأْ captivitas. مَهْلَمْمَأْ مَهْلَمْمَأْ manifestatio, revelatio.
- جَهْمَةُ** manifestabilis.
- جَهْمَةُ i. q. لَكَّمَأْ** .
- لَكَّا , لَكَّا , vide sub لَكَّا .
- لَكَّا , it. لَكَّا et لَكَّا vide s. لَكَّا .
- جَهْمَةُ** inus.; cfr. ar. جَهْمَةُ rasit.
- جَهْمَةُ** novacula, culter, pugio.
- جَهْمَةُ** scutica.
- جَهْمَةُ vel جَهْمَةُ** feretrum, grabatulus.
- لَكَّا , fut. لَكَّمَأْ retexit, revelavit; amovit. Part pass.
- لَكَّا , لَكَّا . - it. adj. manifestus, clarus.
- Pa.** لَكَّا id.
- Ethpa.** لَكَّمَأْ لِ pass.
- Aph.** لَكَّا لِ ut Peal.

تَرْكِيَّةً	rerectio veli; ipsum velum.	تَلْكَلَّ	tulit; se privavit, c. مُـ .
تَرْكِيَّةً	elevatio palpebrarum, veli, etc.	تَلْكَلَّ	Part. pass. تَلْكَلَّ , تَلْكَلَّ spoiliatus.
تَرْكِيَّةً	part. act. Peal ; — it. subst., pl. تَرْكِيَّةً funes quibus suspenduntur vela; it. ut تَرْكِيَّةً .	تَلْكَلَّ	Ethpe. تَلْكَلَّ pass. et reflex.
تَرْكِيَّةً	id. q. تَرْكِيَّةً .	تَلْكَلَّ	تَلْكَلَّ privatio, abstinentia, defectus.
تَرْكِيَّةً	, vide s. تَلْكَلَّ .	تَلْكَلَّ	تَلْكَلَّ abstinentia.
تَرْكِيَّةً	- Exstat Part. præs. Peal تَلْكَلَّ congelans; verb. denom. a تَلْكَلَّ ; cfr. جَلَدَ .	تَلْكَلَّ	تَلْكَلَّ fraudator; privativum nomen, apud gramm.
تَرْكِيَّةً	Ethpe. تَلْكَلَّ congelatus est.	تَلْكَلَّ	تَلْكَلَّ privatio.
تَرْكِيَّةً	Pa. تَلْكَلَّ glaciavit seu in glacie mutavit.	تَلْكَلَّ	تَلْكَلَّ i. q. تَلْكَلَّ privans; avarus.
تَرْكِيَّةً	Aph. تَلْكَلَّ conglavit seu in glacie mutatus est.	تَلْكَلَّ	تَلْكَلَّ defectus.
تَرْكِيَّةً	, et c. l prosth. تَلْكَلَّ , glacies, ar. جَلَدَ .	تَلْكَلَّ	تَلْكَلَّ , fut. تَلْكَلَّ expandit, extendit, inde trop. manifestavit, declaravit.
تَرْكِيَّةً	et تَلْكَلَّ , f. تَلْكَلَّ id.	تَلْكَلَّ	Aph. تَلْكَلَّ manifestavit, declaravit.
تَرْكِيَّةً	et تَلْكَلَّ pellis; cfr. heb. גָלֵד et ar. جَلَدَ .	تَلْكَلَّ	تَلْكَلَّ expansio vestium; manifestatio.
تَرْكِيَّةً	dim. præc.	تَلْكَلَّ	تَلْكَلَّ expandens, extensus; manifestans.
تَرْكِيَّةً	pelliceus.	تَلْكَلَّ	تَلْكَلَّ manifeste.
تَرْكِيَّةً	alga marina. — it. forma quadrilit. verbi تَلْكَلَّ .	تَلْكَلَّ	تَلْكَلَّ id. q. تَلْكَلَّ .
تَرْكِيَّةً	, fut. تَلْكَلَّ fraudavit, diripuit, orbavit; cripuit, abs-	تَلْكَلَّ	تَلْكَلَّ manifestatio.
		تَلْكَلَّ	تَلْكَلَّ vox arab. غَلَّ , error, erratum.
		تَلْكَلَّ	تَلْكَلَّ , vide s. تَلْكَلَّ .
		تَلْكَلَّ	تَلْكَلَّ galarius, plebecula.
		تَلْكَلَّ	تَلْكَلَّ galareii; modus agendi plebis infimæ, vilitas.

volvit, inusit. in *Peal* ;
cfr. , convolutus est,
commotus est, et *infra Pal-*
pel ; it. cfr. *heb.* .

Pa. quasi denomin. a
, fluctibus agitatus est.

Ethpa. agitatus est,
convolutus est.

Aph. volvit.

Palp. circumvolvit,
in orbem circumegit ; abstul-
lit, removit.

Ethpalp. pass. — it.
rotavit ; *nng. est pro*
dissipatus est ; ablatus est.

, acervus, vallum ;
testudo ; *seq.* , glarea.

circinus.

rotundus.

rotunde.

rotunditas.

, *pl.* ,
fluctus.

et foenum, speciat.
stipula arida, stramen.

locus fluctibus, inunda-
tione perruptus ; vallis ; — it.
rotunditas.

, *pro* ,
cranium, vertex.

, ex rota,
circulus.

dimin. præc.
 , *vel* pallium, tapetum ;
stratum jumenti, ar. : cfr.
 s. .

dimin. præced.
 , f. , hebr.
ar. , volumen ; it. in. fem.
membrana.

globus luteus.

et v. sub .

— Cfr. hebr. con-
volvit.

, , it. et
 terra dura, lapido-
sa ; cfr. hebr. massa in-
formis.

vel pallium.

farina alba ; placenta :
cfr. , *vel* .

, , mar-
supium, arca, capsa.

, fut. circumci-
dit.

Ethpe. pass.

os palmulæ.

præputium.

, fut. dolavit,
sculpsit ; cfr. ; trop.
formavit.

Ethpe. pass.

جَهْفَاراً et جَهْفَاراً sculptura.
 جَهْفَاراً dolator, sculptor.
 جَهْفَاراً tabula scriptoria.
 جَهْفَاراً part. pass. *Peal* — inde
 subst. idolum.
 جَهْفَاراً sculptura; trop. poli-
 tio sermonis.

جَهْفَاتاً sine singul. pennae.

جَهْفَرٌ, fut. جَهْفَرٌ rictu denu-
 davit dentes alicui.

Ethpe. جَهْفَرٌ id. pass.

Pa. جَهْفَرٌ ut *Peal*. Part. pass.
 جَهْفَرٌ, diductus labiis; it.
 cruribus distentus.

Aph. جَهْفَرٌ id.

جَهْفَرٌ diductio labiorum rictu;
 separatio erurium.

جَهْفَرٌ rictus.

جَهْفَماً dolium.

جَهْفَمٌ, fut. جَهْفَمٌ scalpsit,
 excoriavit; trop. corruptit.

Ethpe. جَهْفَمٌ id. pass.

جَهْفَمٌ excoriatio.

جَهْفَنٌ — *Cfr. ar.* جَهْفَنٌ riguit,
 durus fuit.

Aph. جَهْفَنٌ pertinax fuit,
 ursit, ausus est.

جَهْفَنٌ pertinacia jumenti.

جَهْدَهُ وَ جَهْدَهُ audax.
 جَهْدَهُ audacia, temeritas.
 جَهْدَهُ سَهْدَهُ, جَهْدَهُ سَهْدَهُ, f. جَهْدَهُ سَهْدَهُ audax.
 جَهْدَهُ سَهْدَهُ audacter.
 جَهْدَهُ سَهْدَهُ audacia, impudentia.
 جَهْدَهُ سَهْدَهُ et جَهْدَهُ سَهْدَهُ id.
 لِجَهْدَهُ سَهْدَهُ immundities.

جَهْلٌ, جَهْلٌ c. camelus;
 funis, rudens; -it. trop. in-
 pl. جَهْلَةً cantherii (gall.
 chevron); *cfr. ar.* جَهْلَةً .
 جَهْلَةً camelopardus.
 جَهْلَةً nom. coll. magnæ for-
 micae.

جَهْلٌ camelarius; simus;
 جَهْلٌ جَهْلٌ trop. instrumen-
 tum musicum.

جَهْلٌ simus, aduncus.

جَهْلٌ nomen litteræ 3^o.

جَهْلٌ, fut. جَهْلٌ succidit.
 جَهْلٌ, جَهْلٌ part. pass.;
 it. repletus, arab. جَهْلٌ plenus
 fuit, de puto, mensura.

Ethpe. جَهْلٌ succisus est;
 plena facta est mensura.

Pa. جَهْلٌ succidit; implevit.

Ethpa. جَهْلٌ id. pass.

جَهْلٌ succisio; repletio.

جَهْلٌ vas; *cfr. ar.* جَهْلٌ vas
 plenum.

فَبَا faba; species ponderis;
cfr. κύκνος.

فَوْيَا fovea excisa.

فَهْرَسٌ, fut. **فَهْرَسٌ** mersus
est, se demersit: *nng.* vomuit.

Aph. **فَهْرَسٌ** l mersit.

فَهْرَنْتَا urinatio, immersio.

فَهْرَنْدَا immersio, manipulus,
pugillus.

فَهْرَنْدَا lutum.

فَهْرَنْدَا fovea.

فَهْرَنْدَا, pl. **فَهْرَنْدَا** id; lutum.

فَهْرَزٌ, fut. **فَهْرَزٌ** mersit;
cfr. ar. **غَوْصٌ** depressior fuit
terra.

Ethpe. **فَهْرُونْ** لि pass.

Ethpa. **فَهْرُونْ** لि id.

فَهْرَنْتَا fovea.

فَهْنَةٌ, fut. **فَهْنَةٌ** et **فَهْنَةٌ**,
cum 1º fut., act. perfectit,
complevit; consumpsit, abo-
levit; c. 2º fut., *intrans.* per-
fectus est, completus est; de-
fecit. Part. præs. **فَهْنَكٌ**,

فَهْنَكٌ perficiens; deficiens;

Part. pass. **فَهْنَمَةٌ**, **فَهْنَمَةٌ**,
perfectus, completus.

Ethpe. **فَهْنَكٌ** perfectus est,
completus est, defecit.

Pa. **فَهْنَكٌ** complevit, consum-

mavit; consumpsit, delebit.

Ethpa. **فَهْنَكٌ** لि pass.

Aph. **فَهْنَكٌ** id. q. Pa.

فَهْنَمَةٌ, **فَهْنَمَةٌ** perfectio, consum-
matio; c. **فَهْنَمَةٌ**, adverbial. **فَهْنَكٌ**
omnino.

فَهْنَمَةٌ consumptio; *vide infra*
فَهْنَمَةٌ.

فَهْنَمَةٌ perfector, *inde* episco-
pus; sacrum corporale.

فَهْنَمَةٌ consummatio, con-
sumptio, finis.

فَهْنَمَةٌ perfecte, omnino.

فَهْنَمَةٌ perfectio, consumma-
tio; summum rei; trop. con-
firmata seu virilis ætas.

فَهْنَمَةٌ, ar. **فَهْنَرَةٌ**, pl. **فَهْنَمَاتٌ**,
it. **فَهْنَمَةٌ** et **فَهْنَمَةٌ**, pruna,
carbo; trop. particula panis
eucharistici consecrati.

فَهْنَمَةٌ mustela, martes.

فَهْنَمَةٌ carbonaceus.

فَهْنَمَةٌ, **فَهْنَمَةٌ**, **فَهْنَمَةٌ**,
فَهْنَمَةٌ et **فَهْنَمَةٌ** **فَهْنَمَةٌ**
bubalus; cfr. pers. **فَهْنَمَةٌ** et
ar. **فَهْنَمَةٌ**.

فَهْنَكٌ, fut. **فَهْنَكٌ** recubuit,
innixus est, accubuit, ar. **فَهْنَكٌ**;
recessit, latuit; **فَهْنَكٌ** part.
præs.; **فَهْنَكٌ** part. præter.
Ethpe. **فَهْنَكٌ** recessit, latuit;
trop. recusavit.

Pa. بَدَّ, *ar.* تَجْعَلُ, accusavit, objurgavit; بَدَّ part. act. بَدَّ part. pass. — *it.* absconditus.

Ethpa. بَدَّ لِ pass. præced.; *it.* sicut *Ethpe.*

Aph. بَدَّ لِ recumbere fecit; *it.* intr. recubuit; بَدَّ تَعْفَى *it.* se subduxit.

Ethpau. بَدَّ لِ id. q. بَدَّ; *it.* quasi denom. a بَدَّ, accusatus est, objurgatus est.

بَدَّ accubitus; abseconsio.

بَدَّ, pl. بَدَّ absconsio, latibulum; in pl. templo idolorum, ipsa idola.

بَدَّ lectus.

بَدَّ, بَدَّ vituperium, querela, contumelia.

بَدَّ part. Aph.; — *it.* subst. accubitus, cubile.

بَدَّ vituperium.

بَدَّ vituperativus.

بَدَّ vituperabilis.

بَدَّ, fut. بَدَّ subripuit, furatus est; trop. celavit, feffellit; c. vel s. بَدَّ furtim se subduxit; gramm. elisit litteram; بَدَّ جَنْ جَنْ occasio- nem arripuit, لَمْ بَدَّ clam se retraxit.

Ethpe. بَدَّ pass. — *it.* se subduxit.

Pa. بَدَّ furtim abstulit.

بَدَّ مَنْ فَرَّ eum furtim as- pexit; *it.* feffellit.

Ethpa. بَدَّ لِ decidit pronun- tiando littera.

بَدَّ et بَدَّ لِ furtum, latro- cinium.

بَدَّ furtivus.

بَدَّ et بَدَّ fur.

بَدَّ لِ furtim, instar furum.

بَدَّ furtivus.

بَدَّ furtum, furto subrep- tum.

بَدَّ et بَدَّ id.

بَدَّ clam, furtim agens illicita.

بَدَّ furtim.

بَدَّ, بَدَّ, stat. emph. بَدَّ,

pro بَدَّ, ar. جَنْ pl.,

بَدَّ, st. const.

بَدَّ, latus corporis; trop.

latus rei, pars, regio; partes,

factio; بَدَّ اسْسَلَا, socius;

بَدَّ لَمْ vel لَمْ بَدَ prope.

بَدَّ لَمْ بَدَ undequeaque.

بَدَّ, vide بَدَّ.

بَدَّ, pers. كَنْدُمْ, triticum.

بَدَّ rotundum.

بَدَّ rotunditas.

لِي verb. denom. volutatus est.

لِي, fut. لَمْ يَنْهَا absecondidit.
Ethpe. لِي subductus est, se abdidit.

لِي, لِي part. pass. Peal ; it. adj. occultus, mysteriosus.
لِي clam.
لِي absconsio, occultatio ; trop. de essentia Dei abscondita.

لِي thesaurarius, pers. لِي, vox formata a لِي, thesaurus, et suffixo دُر : habens, possessor.

لِي, fut. لَمْ يَقْعُدْ obstupuit, compunctus est.

Ethpe. لِي id.

Pa. لِي commovit, terruit, obstupefecit.

Ethpa. لِي ut Peal.

Aph. لِي sicut Pa.

لِي commotio, compunctio.

لِي, لِي part. pass.
Peal. — it. adj. terribilis, violentus, horrendus.

لِي terribiliter.

لِي rel. لِي res stupenda, horrendum quid et terrible, inde etiam motus et scis-

sura terræ ; it. terror, luctus, calamitas.

لِي, γνῶμη, decretum, sententia ; pl. لِي et لِي.

لِي — Aph. لِي, fut. لَمْ يَكُنْ vel لِي c. لَمْ يَكُنْ pers. vel rei, ar. جَنَّ et أَجْنَ, texit, obumbravit ; trop. c. vel sine لِي et c. لِي, protexit ; illapsus est, cecidit, habitavit, c. لَمْ يَكُنْ vel لِي. Part. præs. لِي, it nnq. لِي, f. مَهْلَكَةً, مَهْلَكَةً. Part. præter. لِي, مَهْلَكَةً. لِي cubatio, quies.

لِي, لِي cubile, thalamus, inde trop. beatorum sedes ; لِي id.

لِي f., st. estr. لِي, pl. لِي, vel لِي it. لِي, لِي hortus, ar. حَدَّةً ; trop. paradius.

لِي dimin. hortulus.

لِي hortulanus.

لِي ad hortum pertinens, paradisiacus.

لِي, لِي et لِي f., cfr. heb. لِي et ar. مَجْنَنْ, clypeus.

لِي et لِي مَلْتَهَنْ descensus ; inhabitatio ; inspiratio.

لِي . لِي γένος, pl.

جنساً، et جنساً genus; gens, sexus, familia; جنساً varius. جنساً cog-natus, جنساً ex omni ge-nere.

جنساً verb. denom. cognatum fecit; genus demonstravit.

Ethpa. جنساً لـ pass.

جنساً cognatio.

جنساً، pl. جنساً، جنساً genus.

جنساً in genere.

جنساً natura, genus, cognatio.

جنساً ad genus, familiam spectans, generalis, specie varius; gramm. genitivus, radicalis.

جنساً cognatio; natura.

جنساً generatus; cognatus.

جنساً γνῶσις, gnosis.

جنساً γνωστικός, gnos-ticus.

جـ - Cfr. ar. كـ nasum movit subsannandi causa.

جـ et جـ subsannatio, derisio.

جـ nervus, speciat. ischiati-cus; id. q. جـ et حـ .

جـ fut. جـ eructavit, ar. جـ, evomuit; trop. effu-

dit, effutivit; intrans. erupit fons.

Ethpe. جـ لـ pass.

Pa. جـ eructavit.

Ethpa. جـ لـ pass.

جـ، f. جـ eructatio.

جـ، pl. جـ latus, lumbi; in pl. divitiae.

Aph. جـ verb. denom. in latus recubuit; recumbere fe-cit. Part. act. جـ، جـ .

Part. pass. جـ، nnq. جـ .

جـ part. pass. Aph. —it. ac-tus recumbendi, accubitus, basis; phiala.

جـ repagulum, sera.

جـ، fut. جـ rugiit, mugiit.

جـ et جـ rugitus, mugitus.

جـ latrans.

جـ flagellum.

جـ cadaver.

جـ fut. جـ vocavit, clamavit, mugiit; enixe ro-gavit, c. حـ ; cfr. حـ .

جـ mugitus.

جـ pl. جـ mugitus, clamor.

مُجَعْمًا mugitum edens.

مُجَعْلًا , fut. مُجَعْلًا angustiatus
est, ar. ضَطَّ; vomuit.

Ethpa. مُجَعْلًا horrori fuit.

Aph. مُجَعْلًا surrexit ser-
pens ad venenum injicien-
dum.

مُجَعْلًا angustiae.

مُجَعْلًا part. præter. Peal;
it. exosus.

مُجَعْلًا - Pro inus. Peal, efr.
ar. جَعَنْ constituit.

Ethpe. مُجَعْلًا depositus est,
commissus est.

Aph. مُجَعْلًا tradidit, commisit,
commendavit.

Ettaph. مُجَعْلًا pass.
مُجَعْلًا , مُجَعْلًا depositum.
مُجَعْلًا , pl. مُجَعْلًا commendatio.

مُجَعْلًا , fut. مُجَعْلًا vomuit.
Ethpe. مُجَعْلًا pass.

Pa. مُجَعْلًا , seq. مُجَعْلًا vomitum
movit.

مُجَعْلًا et مُجَعْلًا vomitus.

مُجَعْلًا , fut. مُجَعْلًا et مُجَعْلًا ,
abhorruit, despexit, c. مُجَعْلًا
rel. مُجَعْلًا rei.

Ethpa. مُجَعْلًا aversioni fuit.

Aph. مُجَعْلًاaversari fecit, fas-
tidium movit.

مُجَعْلًا fastidium.

مُجَعْلًا part. pass. Peal;-
adject. exosus, abominabi-
lis.

مُجَعْلًا fastidium.

مُجَعْلًا , fut. مُجَعْلًا increpavit,
c. مُجَعْلًا p.

Ethpe. مُجَعْلًا pass.

مُجَعْلًا et مُجَعْلًا querela; ru-
gitus.

مُجَعْلًا part. pass. Peal; - it.
adj. odiosus, vilis.

مُجَعْلًا deformitas, feeditas.

مُجَعْلًا , vide s. مُجَعْلًا .

مُجَعْلًا - Pa. مُجَعْلًا fodit.

Ethpa. مُجَعْلًا pass.

مُجَعْلًا fossio.

مُجَعْلًا f., heb. حَفَنْ et ar. حَفَنْ , it.
حَفَنْ , contr. a. حَفِيدًا ; plur.
utrinusque formae حَفَنْ .
vitis; حَفَنْ gossypium.

مُجَعْلًا , pl. مُجَعْلًا ,
ala, efr. heb. حَفَنْ et ar. حَفَنْ ; it.
sinus una cum brachiis; trop.
ipsum alatum, pinnula pis-
cium.

مُجَعْلًا v. denom. alas produxit;
trop. pullulavit arbor.

Pa. قَوْفَ, et *Aph.* قَوْفَ alis instruxit.

Ethpa. قَوْفَ لِ pass.

قَوْفَ, pl. قَوْفَ part. præs.; it. contractus, cooptatus.

قَعْدَ part. præt. incurvatus, gibbosus. — subst. anfractus, caverna; f. قَعْدَةَ septum; cfr. حَجَرٌ.

قَعْدَةَ et قَعْدَةَ alatus. قَعْدَةَ easula, tugurium.

قَعْدَةَ, ظُلْمَةَ, id. q. قَعْدَةَ unguis aduneus.

قَعْدَةَ, vide s. حَجَرٌ.

قَعْدَةَ, ar. جَصَّ, gypsum, calx.

قَعْدَةَ denom. gypso illitus est.

قَعْدَةَ, fut. قَعْدَةَ fluxit; cfr. ar. حَجَرٌ.

Pa. قَعْدَةَ incitavit, instigavit.

Ethpa. قَعْدَةَ لِ pass. et reflex. inde etiam bellum movit, c. حَدَّ rei, it. c. حَدَّ pers. et حَدَّ rei; — it. se retraxit, recessit.

Aph. قَعْدَةَ instigavit, قَعْدَةَ هُدَّ incitavit eum adversum me criminando; cfr. ar. أَغْرَى.

قَعْدَةَ instigatio belli, irritatio: afflictio.

قَعْدَةَ provocans, seditionis.

مَهْنَمَةً incitatio, vis illata, impetus.

مَهْنَمَةً instigatio.

مَهْنَمَةً, pl. مَهْنَمَاتٍ, مَهْنَمَةً et لِهْنَمَةً, ar. جَزْزَةً, catulus, spec. leonis. c. suff. مَهْنَمَةً catuli ejus.

مَهْنَمَةً catula,

مَهْنَمَةً, fut. مَهْنَمَةً leprosus fuit.

Ethpe. مَهْنَمَةً leprosus factus est.

Aph. مَهْنَمَةً id.

مَهْنَمَةً, ar. جَرَبَ, lepra.

مَهْنَمَةً, et مَهْنَمَةً, ar. جَرَبَ, leprosus.

مَهْنَمَةً, ar. جَرَابُ, uter coriaceus, pera; vas.

مَهْنَمَةً, ar. حَرِيبٌ, mensura longitudinis et capacitatis (trigesima pars cori).

مَهْنَمَةً f. aquilo, boreas; septentrio; cfr. ar. جَزِيَّا.

مَهْنَمَةً septentrionalis.

مَهْنَمَةً tibiale, soccus; ar. جَزَّبَ.

مَهْنَمَةً, pers. كُرْزَرٌ, homo fallax et astutus.

مَهْنَمَةً — *Pro inus. Peal* cfr. rad. primit. مَهْنَمَةً traxit, et مَهْنَمَةً instigavit.

Pa. **عَزِيزٌ** incitavit, provocavit, ursit; blanditus est.

Ethpa. **عَزِيزٌ لِّ** pass., reflex. et recipr.

عَزِيزٌ vel عَزِيزٌ invitatio: illicium, illecebræ.

عَزِيزٌ illicium, *inde* rete.

عَزِيزٌ incitatio, provocatio.

عَزِيزٌ incitator.

عَزِيزٌ instanter.

عَزِيزٌ id. q. عَزِيزٌ.

عَزِيزٌ clangor; excitatio.

عَزِيزٌ v. den. clangorem edidit.

عَزِيزٌ nucleus; siliqua.

عَزِيزٌ volutavit, prostravit, humiliavit.

Ethpalp. **عَزِيزٌ لِّ** se humiliavit, se prostravit.

عَزِيزٌ volutatio, prostratio; volutatim inflexus sonus.

عَزِيزٌ ، عَزِيزٌ et عَزِيزٌ *ar.* **عَزِيزٌ et قَرْقُسٌ** *جَرَدٌ* culex; genus vermis.

عَزِيزٌ ، vide s. عَزِيزٌ

عَزِيزٌ gleba, argilla.

عَزِيزٌ ، fut. عَزِيزٌ ، ar. عَزِيزٌ, erasit, scalpsit, delevit.

Ethpe. **عَزِيزٌ لِّ** pass.

Pa. **عَزِيزٌ id. q. Peal.**

Ethpa. **عَزِيزٌ لِّ** pass. et reflex.

عَزِيزٌ detritus, erasus; politus, acutus, clarus; *adv.* clare.

عَزِيزٌ erasio; calvus.

عَزِيزٌ polite, urbane, clare.

عَزِيزٌ rasura, ramentum; *it.* morbus *intestinorum.*

عَزِيزٌ erasio.

عَزِيزٌ part. act. *Peal* eradens; - subst. fiber.

عَزِيزٌ locusta.

Pali **عَزِيزٌ** destitutus est, *c.* **عَزِيزٌ rei;** *it.* liquefactus est, deficit, periit; *cfr.* *ar.* **عَزِيزٌ nudus** fuit herba locus. *Part.* *pres.* **عَزِيزٌ**. *Part.* *pass.* **عَزِيزٌ**.

Ethpali **عَزِيزٌ لِّ** *id. q. Pali.*

عَزِيزٌ destitutio.

عَزِيزٌ et عَزِيزٌ *عَزِيزٌ* destitutio, defectus.

عَزِيزٌ glaber; tela, textura, - jugum *textoris*; *it.* *imper.* *verbi عَزِيزٌ*.

عَزِيزٌ fragmenta.

عَزِيزٌ, γέραδιος, *f.* **عَزِيزٌ**, textor.

عَزِيزٌ ars *textoris.*

عَزِيزٌ ambidexter.

عَزِيزٌ erosit, laceravit.

Ethpal. **عَزِيزٌ لِّ** pass.

لِفْوَنْ , ar. جُرْزَةٌ , fasciculus lignorum.

لِفْوَنْ et لِفْوَنْ , vide s. لِفْنَ .

لِفْنَ , fut. لِفْنَ abscidit, comminuit; trop. decrevit; et لِفْنَ intrans. decretum est; impers. لِفْنَ مَعْنَ statutum est, actum est. Part. pass. لِفْنَ ; - adj. acutus; - adv. certo.

Ethpe. لِفْنَ لِ pass.

Pa. لِفْنَ denomin. a لِفْنَ , exossavit; it. ut Peal, decrevit, constituit.

لِفْنَ abscissio; it. ut لِفْنَ et لِفْنَ .

لِفْنَ comminuens, inde subst. radius pistoris quo explanatur et comminuitur massa; it. mortarium.

لِفْنَ vel لِفْنَ mortarium.

لِفْنَ absolute.

لِفْنَ , لِفْنَ decisio.

لِفْنَ , لِفْنَ , cfr. heb. מֶלֶג os, nucleus; trop. ipse.

لِفْنَ et لِفْنَ لِفْنَ os elephantis: ebur.

لِفْنَ eburneus.

لِفْنَ et لِفْنَ لِفْنَ osseus.

لِفْنَ nucleus.

لِفْنَ لِ et لِفْنَ لِ , σκελετός sceletus, ossea corporis forma.

لِفْنَ لِ et لِفْنَ لِ γραμματική , grammatica.

لِفْنَ لِ grammaticus; pl. لِفْنَ لِ لِفْنَ لِ γραμματικοί.

لِفْنَ لِ turbator.

لِفْنَ لِ farina alba, simila.

لِفْنَ لِ , لِفْنَ لِ , it. لِفْنَ لِ et لِفْنَ لِ , γράμμα, pondus.

لِفْنَ لِ , ar. جُرْزَةٌ , labrum, lavacrum lapideum; arca.

لِفْنَ لِ porcellus.

لِفْنَ لِ , fut. لِفْنَ لِ et لِفْنَ لِ tritus est, comminutus est; trop. periit; it. nnq. trans. comminuit. Part. pass. لِفْنَ لِ ; subst. frusta panis. لِفْنَ لِ سُلَّا comminutus seu destitutus robore.

Ethpe. لِفْنَ لِ ut Peal in sens. intr.

Pa. لِفْنَ لِ comminuit, perdidit. pupigit, interfecit.

Ethpa لِفْنَ لِ deletus est.

Aph. لِفْنَ لِ id.

لِفْنَ لِ comminutio.

لِفْنَ لِ لِفْنَ لِ comminutio, consumptio, ipsa res commi-

nuta ; pernicies ; <i>trop.</i> finis mensis lunaris.	<i>Ethpe.</i> جَنَاحٌ لِّ pass.
جَنَاحٌ cibus sorbilis e tritico contrito paratus.	<i>Pa.</i> جَنَاحٌ ut. <i>Peal.</i>
جَنَاحٌ part. act. <i>Peal.</i> ; subst. serpens, aspis ; seq. جَنَاحٌ , antonom. Satan ; — <i>it.</i> farina.	<i>Aph.</i> جَنَاحٌ abripuit.
<i>Ethpa</i> جَنَاحٌ لِّ verb. denom. serpens factus est.	جَنَاحٌ inundatio, diluvium.
جَنَاحٌ destructivus.	جَنَاحٌ id.
جَنَاحٌ et جَنَاحٌ مُّهْنَدًا comminutio, destructio.	جَنَاحٌ , f. جَنَاحٌ abripiens, inundans ; — <i>it.</i> subst. in fem., pala, ar. جَارُوقة .
جَنَاحٌ malus, injustus.	جَنَاحٌ pala, cochlear.
جَنَاحٌ fames.	جَنَاحٌ pala, ar. مجرفة , it. cochlear, ar. مجرفة .
جَنَاحٌ inops, pauper.	جَنَاحٌ , pl. جَنَاحٌ γραφεῖον, stylus.
جَنَاحٌ , fut. جَنَاحٌ rasit, totondit.	جَنَاحٌ — Part. جَنَاحٌ expla-
<i>Ethpe.</i> جَنَاحٌ لِّ pass.	nans, comminuens massam ;
جَنَاحٌ rasura, tonsura.	cfr. جَنَاحٌ et ar. قرص .
جَنَاحٌ et جَنَاحٌ tonsor.	جَنَاحٌ et جَنَاحٌ f. جَنَاحٌ , pl. جَنَاحٌ et جَنَاحٌ frustum panis, placenta, ar. قرص .
جَنَاحٌ imberbis, tonsus, inde subst. monachus ; puer, famulus.	جَنَاحٌ , ar. جَرْ , fut. جَنَاحٌ traxit, extraxit, abripuit ;
جَنَاحٌ id. q. جَنَاحٌ .	<i>trop.</i> , seq. جَنَاحٌ pers. et جَنَاحٌ , insimulavit criminis. Part. act. جَنَاحٌ , f. جَنَاحٌ ; pl., m. جَنَاحٌ , f. جَنَاحٌ .
جَنَاحٌ id. q. جَنَاحٌ .	Part. pass. جَنَاحٌ ; <i>it.</i> trahens.
جَنَاحٌ ars tonsoris.	<i>Ethpe.</i> جَنَاحٌ لِّ pass.
جَنَاحٌ novacula.	<i>Aph.</i> جَنَاحٌ traxit ; — <i>it.</i> <i>Aph.</i> verbi جَنَاحٌ .
جَنَاحٌ , fut. جَنَاحٌ , cfr. heb. جَرْ et ar. جَرْ , abripuit, inundavit, everrit ; <i>trop.</i> abs-tulit ; — <i>it.</i> hausit, ar. غَرَفْ .	<i>Palpel.</i> جَنَاحٌ traxit, rapuit.

contrectavit, excitavit; consideravit.

Ethpe. ~~م~~ لِ pass.

Aph. اَحْمَدٌ *nexuit.*

تَقْرِيْبٌ et **تَهْكِمٌ** tactus, con-trectatio, percussio.

فَعْلَمْ, **فَعْلَمْ** palpabilis.

حَرْبَجْوَانٌ harpago, uncus
ferreus.

كُوشك **لِه مَعْنَا** palatium; *pers.* (gall. Kiosque).

جِنْدَلْ, **جِنْدَلْ** et **جِنْدَلْ** pons,
cfr. ar. **جِنْدَلْ**; it. **ut جِنْدَلْ**.

جَعَلَ, fut. **جَعَلْتُ** verb. denom.
pontem extruxit, instar
pontis exstruxit, ponte con-
junxit; cfr. heb. קָשַׁר collig-
avit.

Ethpe. ~~is~~ *Li* pass.

*lī et lō pontis ex-
structio,*

trabs.

שָׁמַיִם, fut. **שָׁמַיְתִּים**, cfr. heb.

جَسَّ *et ar.* **جَسَّ**, palpavit, te-
tigit; *trop.* exploravit.

Ethpe. ~~و~~ لی pass.

Aph. $\omega \tilde{\epsilon}^l$ palpavit.

Ethpa ~~h~~ tactu cognitus est.

Palpel  *sæpius palpavit.*

tac tactus.

 lenitus, emollitus.

 quod tangitur, *inde* fundus.

جَاسُوسٌ

Exploration

ପ୍ରାଣ f., st. const. **ପ୍ରାଣ**; pl.

تَمْتُّعٌ, tactus, palpabilitas;
exploratio.

lāmā *ut* *lāmā*

مُعْتَدِلٌ tangibilis.

Fractus, attritus animo.

 fæx, amurca.

? quarta litera alphabeti: numerice valet: , vel ; = 4, ; = 4000. ; = 40000. ; = $\frac{1}{4}$; ubi vero , altera præfigitur, eadem signa numeros ordinales exprimunt: ; ; = quartus. etc.

^{1°.}, est pronom. relativ. utriusque generis et numeri: **هَذِهِ** homo qui, **هُوَ** is qui, **أَنَا**, ea quæ, **هُوَ** illi qui etc.; - emphatice habet post se pronom. pers.: **أَنْتَ**, qui. **أَنْتِي**; qui.; **أَنْتَ وَمَنْ تَرَى** **أَنْتِي** qui princeps insulæ erat.

2º. , est etiam pronomen demonstr. simul ac relativum
= ille qui, ea quæ, id quod,
illi qui, etc, ex.: وَهُمْ مُحَمَّدٌ illi qui sunt de domo Jacob,
وَكُلُّهُمْ res mundi, وَسَهُوكَ ille
qui subripuit, وَكُلُّهُوكَ et illi
qui cum eo erant.

3°. nota est genitivi et diverse
relationis, unde varie reddi
debet : ﴿۱۵۰﴾ Filius Dei : -
﴿۱۵۱﴾ مُحْمَدٌ فِي الْفِي
fides in

Christum ; وَأَكْتُمْا مَهْسِبًا a
Deo percussus. كُلْتُمْ وَكُلْتُمْ ze-
lus propter domum tuam.
bellum contra
rebelles ; - interrogat. بِمَنْهُ وَبِمَنْهُ
cujus ?; ۝ اَمْلُ مَهْسِبًا ejus ex
iis. — c. , ante et post de-
monst. ۝، ejus, etc. بِعَنْهُ وَبِعَنْهُ
۝، قُبْهُنْا مَهْسِبًا quorum primus
fuit ; c. præp. بِهِ وَبِهِ in quo,
وَهُنْهُنْ ex qua, كُلْهُ . . . cui,
وَهُنْهُنْ quod attinet ad dicta
eius.

4º. ? *præfixum substantivo*
facit adj. vel adverbium, اَكْلَمُ
Deus verus: وَسَعِدُوا
amor verus, وَمُحَمَّداً *statim,*
voluntario; - *præfixum*
numero cardinali facit ordi-
nalem. وَأَكْلَمُ *tertius.*

5°, nota est conjunctionis :

- 1) *relativæ* : quod, ὅτι.
- 2) *causalis* : eo quod, quia,
quoniam, ὅτι τὸ inde quod.
- 3) *finalis*: ἵνα, ut, eo fine ut.
ἵνα, ut ne, seq. *futuro*.
- 4) *temporis vel loci* : quum,
ubi, postquam.

6°. In interrogacione indirecta æquivalet particulæ : num.

7°. Signum est orationis direc-tœ, sive loquentis, sive alterius; æquivalet scilicet dup-lici puncto. وَهُنَّ مُؤْمِنُونَ وَأَوْمَعْتُمُوهُنَّ مُنْكَرًا et dicamus: Dominus justus est. وَمَحْدُوا نَجَّاتُهُ et dicebat: sabbatum factum est.

8° Tandem, est aliquando ex-pletivum; aut iterat. مَهْمَنْتُمْ وَمَهْمَنْتُمْ credimus Do-mino esse terram.

وَحْسٌ, et وَاحْدَةٌ, heb. ذَئْبٌ, ar. ذَئْبٌ pl. وَاحْدَاتٍ, lupus; f. وَاحْدَةٍ, lupa, plur. وَاحْدَاتٍ; trop. meretrix.

وَاهْدٌ id. q. وَاهْدٌ, vide s. وَاهْدٌ. et وَاهْدٌ, cfr. ar. ذُبٌ, ursus, ursa.

وَحْدَةٌ et وَحْدَةٌ m., heb. זְבּוֹב, ar. ذَيْبٌ, musca. pl. وَحْدَاتٍ. وَحْدَةٌ musca canina, pl. وَحْدَاتٍ.

وَحْدَةٌ, ar. ذَبَاغْ, coriarius. وَحْنَةٌ et وَحْنَةٌ, ar. pers. دَيَّاجَةٌ, vestis serica auro picta.

وَحْسٌ, fut. وَحْسٌ et وَحْسٌ, heb. זְבּוֹב, ar. ذَبَاغْ, mactavit, immolavit, sacrificavit. Part.

act. وَحْسٌ, وَحْسٌ ; in st. c. pl. وَحْسٌ.

Ethpe. وَحْسٌ i pass.

Pa. وَحْسٌ sacrificavit, immola-vit.

and وَحْسٌ et وَحْسٌ sacrificium, vic-tima.

and وَحْسٌ sacrificator.

and وَحْسٌ immolatio.

and وَحْسٌ id. q. وَحْسٌ.

and مَبْحَسٌ, مَبْحَسٌ altare.

and وَحْلَدٌ, pl. وَحْلَدَاتٌ, pla-menta ex ficubus confecta.

وَحْلٌ, fut. وَحْلٌ et وَحْلٌ pupugit ; congescit.

Ethpe. وَحْلٌ i pass.

Pa. وَحْلٌ sæpe pupugit.

Ethpa. وَحْلٌ i pass.

وَحْلٌ punctio, morsus.

وَحْلٌ pungens, inde aculeus. وَحْلٌ et وَحْلٌ وَحْلٌ punctio, mor-sus.

مَبْحَسٌ pungens.

وَحْلٌ et وَحْلٌ fut. وَحْلٌ agglutinatus est, adhæsit, co-hæsit.

Ethpe. وَحْلٌ id.

Pa. وَحْلٌ agglutinavit, cohæ-re fecit, compegit.

Ethpa. وَحْلٌ i pass; trop. comitatus est.

Aph. حَوْجَلَ agglutinavit, adhaerere fecit, adjunxit.

حَوْجَلَةُ glutinatio.

حَمَّا commissura ; glutinum ; حَمَّةُ commissura.

حَمَّاً glutinatorius ; glutinum, viscum.

حَمَّاً، حَمَّاً adhaesivus, annexus, adhaerens, sequens ; gramm. relativum pronomen, pl. حَمَّاً intransitiva verba.

حَمَّاً agglutinatio, adhaesio ; affixio, phrasis relativa ; pl. حَمَّاً ipsa affixa, حَمَّاً glutinamentum, viscum ; tegumen ; tomus.

مَهْمَنَا adhaesivus.

حَمَّنَ، fut. بَكَنَ، imper. حَمَّهُ، duxit, ad se ducendum curavit, abduxit, induxit ; cepit, rapuit ; aravit, c. vel sine قَبَّا ; trop. rexit, gubernavit. ; intrans. profectus est, vagatus est. Part. act. حَمَّ، f. حَمَّةُ ; plur. حَمَّاً، in st., const. حَمَّاً ; part. pass. حَمَّاً ; it. in sensu act. ducentis, agens.

Ethpe. حَمَّنَأْنِ pass; se gessit ; trop. obsecutus est. حَمَّنَأْنِ لَفْحَمَنَأْنِ promotus est ad episcopatum.

Pa. حَمَّنَأْنِ sicut Peal.-it. c. tractavit, consilium init. مَهْمَنَا part. act. et pass. — in st. c. pl. مَهْمَنَا.

Ethpa. حَمَّنَأْنِ pass. id. q.

Ethpe. حَمَّنَأْنِ e mundo eruptus est, كَمَّنَأْنِ in eo sum ut moriar.

Aph. حَمَّنَأْنِ egit, tractavit, rexit.

حَمَّنَأْنِ ductus currus, aratri ; abductio ; agmen.

حَمَّنَأْنِ، حَمَّنَأْنِ præda ; trop. obitus.

حَمَّنَأْنِ actor, ductor ; it. in pl. deducentes mortuum.

حَمَّنَأْنِ ductio.

حَمَّنَأْنِ، حَمَّنَأْنِ ductus, institutio, administratio ; agendi ratio, norma, modus, ratio vitæ, mores ; vita ascetica.

حَمَّنَأْنِ modalis.

حَمَّنَأْنِ ager, desertum.

حَمَّنَأْنِ agrestis, sylvestris.

حَمَّنَأْنِ، مَهْمَنَا desertum.

حَمَّنَأْنِ مَهْمَنَا ad desertum pertinens, desertus.

حَمَّنَأْنِ id., inde eremita.

حَمَّنَأْنِ dux, rector, præfector, judex ; abbas. حَمَّنَأْنِ f. abbatissa.

حَمَّنَأْنِ secundum oeconomicam, speciat. providentiam divinam.

تَحْمِلُ et تَحْمِلُ transverberatio.

تَحْمِلُ percussor.

تَحْمِلُ transfossio.

أَلْوَانُ , v. s. ٩٥٦ .

أَلْوَانُ quereus, ulmus.

أَلْوَانُ , تَلْوِنُ aurum, vectigal lustrale ; v. aff. أَلْوَانُ aurum meum. تَلْوِنُ دَهْنٌ parasceve aurea, seu feria sexta post Pentecosten.

أَلْوَانُ وَخْتَنْ f. دَهْنٌ et دَهْنٌ f. دَهْنٌ , pl. حَنْتَنْ aureus ; تَلْوِنُ verb. denom, deauravit. Part. pass. أَلْوَانُ مَدْعُونٌ ; تَلْوِنُ فَتَّنْ petitiones auro, donis obtentæ.

Ethpa. أَلْوَانُ pass.; trop. honoratus est.

Aph. أَلْوَانُ auro obduxit.

تَسْرِيكٌ vestis serica, pannus splendens.

أَذْهَلَ - Aph. أَذْهَلَ , ar. أَذْهَلَ , obstupefecit.

أَنْجَلَ et أَنْجَلَ , fut. أَنْجَلَ pinguis factus est.

Ethpe. أَنْجَلَ pass.

Pa. أَنْجَلَ unxit,

Ethpa. أَنْجَلَ pass. et reflex.

Aph. أَنْجَلَ saginavit, unxit.

أَنْجَلَ وَأَنْجَلَ unguentum, adeps; pinguedo. أَنْجَلَ دَهْنٌ qui in deliciis vivit ; pl. دَهْنٌ نَّجَلَ .

أَنْجَلَ pinguis.

أَنْجَلَ وَأَنْجَلَ pinguedo; teneritas; metaph. splendor.

أَنْجَلَ , pers. دَهْنَانٌ , praejectus loci vel provinciae.

أَنْجَلَ adeps.

أَنْجَلَ et أَنْجَلَ , fut. أَنْجَلَ miser fuit; impers. حَكَّ أَنْجَلَ me doluit. Part. præs, أَنْجَلَ , أَنْجَلَ , f. emph. أَنْجَلَ , pl. أَنْجَلَ , emph. أَنْجَلَ f. أَنْجَلَ , أَنْجَلَ miser. Part. præter. أَنْجَلَ , أَنْجَلَ , f. emph. أَنْجَلَ miser.

Ethpe. أَنْجَلَ miser factus est.

Pa. أَنْجَلَ humilem, miserum redidit; purgavit

Aph. أَنْجَلَ afflixit, Part. act. مَبْهَلَةً , مَبْهَلَةً ; pass. مَبْهَلَةً .

Ettaph. أَنْجَلَ لَلَّا ut Ethpe.

أَنْجَلَ , أَنْجَلَ miseria, dolor.

أَنْجَلَ , id.

أَنْجَلَ , misere.

أَنْجَلَ , pl. أَنْجَلَ مَيْسَرَةً miseria.

أَنْجَلَ dimin. miserculus.

أَنْجَلَ cantharides.

تَمْلِيَةٌ, ar. التَّمْلِيَةُ, Templarii.

تَمْلَأَ fut. تَمْلَأَ colliquit, effluit, gonorrhœa, haemorrhagia laboravit; trop. languit.

Pa. تَمْلَأَ liquefecit, fluere fecit; trop. tabescere fecit, afflixit.

Ethpa. تَمْلَأَ pass. ; it. tabuit.

تَمْلَأَ, fluxus, stillatio, speciat. gonorrhœa, haemorrhagia.

تَمْلَأَ, تَمْلَأَ fluxus sanguinis.

تَمْلَأَ, fluxus; trop. tabes.

تَمْلَأَ, gonorrhœa laborans.

تَمْلَأَ, liquidus, fluxilis.

تَمْلَأَ, fluxus.

تَمْلَأَ, تَمْلَأَ liquecere, tabescere faciens.

تَمْلَأَ, pers. ذَوَاعَ, lac acidum.

تَمْلَأَ, pl. تَمْلَأَ et تَمْلَأَ دόγμα, dogma, doctrina, secta.

تَمْلَأَ — *Pa.* تَمْلَأَ turbavit.

Ethpa. تَمْلَأَ pass.

تَمْلَأَ, insanus.

تَمْلَأَ, heb. טַלְאָה, olla, lebes.

تَمْلَأَ perturbatio, confusio.

تَمْلَأَ perturbans, agitans.

تَمْلَأَ perturbate, confuse.

تَمْلَأَ perturbatio.

تَمْلَأَ et تَمْلَأَ confusio, turbatio.

تَمْلَأَ heb. טַלְאָה, patruus; it. amicus.

تَمْلَأَ consobrinus.

تَمْلَأَ amita.

تَمْلَأَ cognatio ex parte patrui.

تَمْلَأَ et تَمْلَأَ مَنْقُونَهُ lenocinium.

تَمْلَأَ مَنْقُونَهُ f. مَنْقُونَهُ leno, f.

تَمْلَأَ مَنْقُونَهُ id.

تَمْلَأَ مَنْقُونَهُ psalterium Davidis.

تَمْلَأَ et تَمْلَأَ locus. pl.

تَمْلَأَ st. constr. تَمْلَأَ, adverb. pro, more, ad instar.

تَمْلَأَ dux.

تَمْلَأَ δόξα, gloria, fama.

تَمْلَأَ, fut. تَمْلَأَ, se com-
movit; surrexit, intravit, des-
cendit; comiter se gessit.

Pa. تَمْلَأَ ministravit.

Aph. تَمْلَأَ excitavit, movit, in-
trare fecit, intravit.

Ethpalp. تَمْلَأَ se libravit.

تَمْلَأَ situla.

تَمْلَأَ famulatus.

تَمْلَأَ ministerium.

تَمْلَأَ diarrhoea.

تَمْلَأَ oscillum.

تَمْلَأَ minister, famulus, f.

تَمْلَأَ .

تَمْلَأَ famulatus.

تَمْلَأَ, fut. تَمْلَأَ judicavit, dijudica-

vit, litigavit cum c. حَدَّ pers.
litigavit pro, cum حَدَّ pers;
trop. imperavit, vindicavit,
damnavit. فَحَدَّا somnium
interpretatus est.

Ethpe حَوْلَلَ pass.; it. litigavit,
correptus est. هَذِهِ حَدَّا وَهُنَّا
non judicando. هَذِهِ مَتَّا aequ-
um visum est.

حَدَّا، وَمَتَّا judicium, sententia,
lis, causa, alteratio, jus,
justitia, lex, decretum, con-
demnatio; somni interpreta-
tio. حَدَّةِ وَمَتَّا decisio judicij
i. e. poena. حَدَّهُ وَسَلَّا tribunal.
وَمَتَّا justitia, rectitudo.

حَدَّا، وَمَتَّا، وَمَنَّا، وَمَنَّا
judex, f. حَدَّا، وَمَنَّا, pl.
وَمَنَّا.

وَمَنَّا munus judicis, actus
judicandi.

حَدَّا judicium, actus judicandi.
حَدَّا، وَمَنَّا، pl. حَدَّا، وَمَنَّا
حَدَّا، وَمَنَّا urbs, civitas.

حَدَّا، وَمَنَّا dim. oppidulum.
حَدَّا civilis, civicus, civis
pl. حَدَّا.

حَدَّا، وَمَنَّا politia.

حَدَّا، وَمَنَّا judicandus, damnatus.

حَدَّا، وَمَنَّا judicium.

et حَدَّا، وَمَنَّا pl.
حَدَّا، وَمَنَّا διπτυχον, dip-
tycha.

διακρινόμενοι, mono-
physitae.

جَنْ؟ fut. بَلَّ exultavit, salta-
vit.

Pa. حَمْسَ exsultavit, trepidavit;
it. laetificavit.

جَوْزَا gaudium.

جَهْنَمَةِ exultatio.

جَيْرَا id.

جَوْزَا dorcas, f. حَمْسَ .

جَهْنَمَةِ qui saltare facit.

جَنْ؟ fut. بَلَّ aspergit, obser-
vavit; insidioso intuitus est.
Part. act. حَفَّا, f. حَمْسَ ; -it.
subst. speculator.

Pa. حَنْقَ id.

Aph. آَوْمَكَ id. ac Peal.;
trop. apparuit.

بَلَّ visus, prospectus, obser-
vatio, — it. videns; specula-
tor, observator, insidiator;
metaph. episcopus; it. locus e
quo prospicitur, specula, sco-
pus.

جَهْنَمَةِ observationi stellarum
inserviens.

جَهْنَمَةِ observatio, actus insi-
diandi.

جَهْنَمَةِ actus videndi, observan-
di.

جَهْنَمَةِ intuens.

مِنْهُمَا مِنْبَعٌ part. pass. peritus, perspicax; **مِنْهُمْ كَ** scio.

مِنْهُمْ عَلَا intuitio, perspicacia, peritia.

مِنْهُمَا mantica.

وَ, fut. **وَهُوَ** habitavit, man sit.

Pa. **وَهُوَ** habitavit, versatus est, circumivit.

وَهُوَ, **أَوْهُوَ** orbis; series dentium; pompa, processio.

مِنْهُمْ contignatio, conclave.

مِنْهُمْ habitator. **وَهُوَ** et **أَوْهُوَ** δωρεά, donum factum sponsae.

أَوْهُوَ orbis; genciva.

وَهُمْ habitatio, præsertim monasterium, in pl. **أَوْهُمْ**; it. ovile. **وَهُمْ** archimandrita.

وَهُمْ domuncula.

وَهُمْ habitatio. **وَهُمْ** tranquille, silenter.

وَهُمْ incola.

وَهُمْ ad ovile pertinens; monachus, f. **وَهُمْ** monacha.

وَهُمْ vita monastica.

وَهُوَا, **وَهُوَ**, heb. יָדוֹ, ætas, generatio, sæculum.

وَهُوَا, **وَهُوَا** atrium, aula domus.

وَهُوَا, fut. **وَهُمْ** calcavit; metaph. contemptus.

Ethpe. **وَهُلْلِي** pass.

Pa. **وَهُنْ** id. ac Pe.

Ettaph. **وَهُلْلِي** sicut Ethpe.

مِنْهُ calcatio; id quod calcatur.

مِنْهُ calcatio; obtritus; metaph. contemptus.

مِنْهُ calceptor; trop. contemptor.

مِنْهُ calcabilis, pervius.

أَوْهُوَ species herbae salsaæ.

وَهُمْ, fut. **وَهُمْ** impulit, expulit.

Ethpe. **وَهُلْلِي** pass.

Pa. **وَهُنْ** ut Pe.

Ettaph. **وَهُلْلِي** ut Ethpe.

وَهُنْ propulsio.

وَهُنْ propulsativus, repulsivus.

وَهُنْ expulsio, impulsio.

وَهُنْ Pe. inus.

Pa. **وَهُنْ** pulverizavit.

Ethpa. **وَهُلْلِي** pass.

Palp. **وَهُنْ** ut Pa.

وَهُنْ in pulverem resolutus, minutus, inde pulvis. **وَهُنْ** filius pulveris: homo.

وَهُنْ, fut. **وَهُنْ** timuit, formidavit, veritus est, cum. acc.

aut **وَهُوَا** pers. vel rei.

<i>Pa.</i> وَسْكَنَ	terruit, tremefecit.	وَسْكُنْا id.
<i>Aph.</i> وَسْكَنَ	id.	وَسْكُنْا repellens.
<i>Ethpa.</i> وَسْكَنَ لِ pass.		وَسْكُنْا repulsio, afflictatio.
وَسْكَلَ	timor.	وَسْكُنْا مَهْسُونْتَا, مَهْسُونْتَا repudiatorius.
وَسْكَنَا	timor, terror, timor reverentialis, religio, cultus, secta, <i>pl.</i> وَسْكَنَا — <i>it.</i> id quod timetur, <i>inde</i> idolum, numen; خَمْدَةْ وَسْكَنَا templum.	وَسْكُنْا مَهْسُونْتَا repudiatio. وَسْكُنْا مَهْسُونْتَا rejiciendus.
وَسْكَلُ	terror, terriculamentum, timidus, <i>pl.</i> وَسْكَلَا .	وَسْكَلَا lapis molaris.
وَسْكَلَ	timens, tremens.	وَسْكَلَا duritia.
وَسْكَلَةْ	f. وَسْكَلَةْ multum timens, timidus ; pius.	وَسْكَلَةْ verb. denom. durum, soli- dum fecit.
وَسْكَلَةْ	timiditas, excessus timoris.	وَسْكَلَةْ pl. وَسْكَلَاتْ satelles.
وَسْكَلَةْ	— <i>adj.</i> timidus, territus.	وَسْكَلَةْ , heb. מַמָּא mamma.
وَسْكَلَةْ	cum timore ; pavide, terribiliter.	وَسْكَلَةْ وَمَنْدَلَا dæmon, <i>pl.</i> وَمَنْقَا .
وَسْكَلَةْ	terror ; <i>metaph.</i> ma- jestas, reverentia.	وَسْكَلَةْ وَمَنْدَلَا dæmonia. وَمَنْدَلَا
وَسْكَلَةْ	terrefactio.	superstitio.
وَسْكَلَةْ	terrificans.	وَسْكَلَةْ وَمَنْتَهَا amen- tia affecit, obsessit.
وَسْكَلَةْ	et minus recte وَسْكَلَةْ mi- lium.	وَسْكَلَةْ وَمَنْتَهَا dæmonone agitatus fuit.
وَسْكَلَةْ	fut. بُسْكَلَةْ trusit, eje- cit, expulit.	وَسْكَلَةْ وَمَنْتَهَا dæmoniacus, <i>pl.</i> وَمَنْتَهَا , f. وَسْكَلَةْ وَمَنْتَهَا dæmoniae, <i>pl.</i>
وَسْكَلَةْ		وَسْكَلَةْ وَمَنْتَهَا dementia
وَسْكَلَةْ		وَسْكَلَةْ وَمَنْتَهَا dæmoniacus.
وَسْكَلَةْ	, ar. دِيَوَانٌ , codex rationum (registre).	
وَسْكَلَةْ	ut <i>Peal.</i>	
وَسْكَلَةْ	Lِ pass.	
وَسْكَلَةْ	actus repellendi.	خَمْدَةْ وَمَنْتَهَا , atramentum. وَمَنْتَهَا atramentarium.

اَپرْ aper.

مِلْيَارْ milliarium, index viæ, pharus.

بَالْنِيْعَمْ balneum; vectigal.

نَبْلَةُ , ar. نَبْلَةُ , ros in terram decidens, nebula.

فِيْدِيْ دِيْ partic. vero, enim. hæc particula primæ voci phrasis postponitur, aliquando expletiva est præsertim post حَتَّىٰ , حَتَّىٰ لَهُ , حَتَّىٰ .

دِنَارْ , plur. دِنَارُوْا denarius.

وَمِنْ , v. sub. وَمِنْ .

وَمِنْ partic. compos. ex relat. قَوْنِيْدِيْ primit. et اَسْمَاءُ semper cum suffixis pronom. jungenda et æquivalens pronom. vel adject. possess., ex.: وَمِنْ qui, quæ, quod mihi est, seu meus, mea, meum, mei, meæ. وَمِنْ qui, quæ, quod ipsi, seu suus, sua, suum, sui, suæ, sua; ità porro cum aliis suffix. pronom.

وَمِنْ meum est, وَمِنْ tuum est. وَمِنْ res ejus est. وَمِنْ ejusdem. وَمِنْ sua agendi ratione.

وَمِنْ per se, seorsum.

وَمِنْ مِنْ ex partibus

eorum. مِنْ وَمِنْ vel مِنْ ex se ipso, suo marte. Nomina græca plerunque non accipiunt suffixa: inde possessio exprimitur per وَمِنْ , ex: مَكْنُونْ وَمِنْ clerus ejus. — Nnq. وَمِنْ expletivum est: وَكَمَانْ وَكَمَانْ oratio mea. وَمِنْ , pl. وَمِنْ , f. وَمِنْ , pl. وَمِنْ proprius; subst. in fem. proprietas, indoles. وَمِنْ وَمِنْ proprietates Christi.

وَمِنْ proprietas.

وَمِنْ proprie, speciatim, peculiarter, seorsim.

وَمِنْ proprius, particularis.

وَمِنْ proprietas.

وَمِنْ , pl. وَمِنْ et وَمِنْ falco- nis genus.

وَمِنْ وَمِنْ διαθήκη , et وَمِنْ pactum, testamentum, pl. وَمِنْ وَمِنْ et وَمِنْ .

وَحْلَانْ , fut. بَخَا ; et usitat. وَحْلَانْ mundus, mundatus fuit. وَحْلَانْ ,

وَحْلَانْ part. act. qui mundus fit. وَحْلَانْ , part. pass. et adj. purus; c. حَمْ immunis a, pri- vatus.

Pa. وَحْلَانْ mundavit, purificavit, purgavit, seq. حَمْ .

Ethpa. إِثْبَاتٌ pass. mundatus est.

وَحْمَارٌ purificatio ; splendor.

وَحْمَلَهُ pure.

وَحْمَلْتُ purificatio, mundities.

وَحْمَدًا id ; expiatio, purgatio corporis ; inde excrementum.

وَحْمَدًا p. act. Pa. purificans, mundans. — Subst. novacula.

وَحْمَدْرًا, δοκίον, lychmochus.

وَحْمَنَ, fut. وَحْمَنَ meminit, memoravit, seq. وَلَيْلَةً rel. وَلَيْلَةً. Part. pass. وَحْمَنٌ memoratus ; it. recordans.

Ethpe. إِثْبَاتٌ id.

Aph. وَحْمَنَ recordari fecit, recordatus est, commemoravit.

Ethpa. إِثْبَاتٌ pass. recordatus est, meminit, in memoriam retulit.

وَحْمَدُوا recordans.

وَحْمَدْنُونَ, نَمْذَنَوْجُونْ memoria, commemoratio, mentio, fama, laus, honor ; it. adminiculum memorie.

وَحْمَنَ memor.

وَلِسْنًا masculus ; membrum virile ; nomen masculinum ; it. aries ; وَلِسْنَهُ مُمْلِكَةً balista

bellica, pl. وَلِسْنَاتٌ - it. constellatio arietis.

وَلِهَامَهُ in genere masculino.

وَلِهَامَهُ id.

وَلِهَامًا genus masculinum.

وَلِهَامًا et وَلِهَامًا, وَلِهَامًا masculinus.

وَلِهَامًا et وَلِهَامًا, وَلِهَامًا genus masculinum ; virilitas.

وَلِهَامًا commemoratio.

وَلِحَدْرًا platanus.

وَلِحَسَّ, fut. تُبَكَّس turbavit, commovit.

Ethpe. إِثْبَاتٌ id.

Pa. وَلِحَسَّ ut Pe.

Aph. وَلِحَسَّ ut Pa.

وَلِحَسَّ perturbatio, pavor ; it. tumultus.

وَلِحَسَّ perturbator.

وَلِحَسَّ part. pass. turbatus ; adj. turbidus, impurus.

وَلِحَسَّ turbatio.

وَلِحَسَّ perturbator.

وَلِحَسَّ مُمْلِكَةً perturbabilis.

وَلِسْنَهُ, fut. وَلِسْنَهُ hausit aquam. ; it. eduxit, eripuit, sustulit. Part. act. وَلِسْنَهُ ; pass. وَلِسْنَهُ ; وَلِسْنَهُ id.

Ethpa. وَلِسْنَهُ id.

وَلِسْنَهُ actus lauriendi, educendi.

وَلِسْنَهُ ut وَلِسْنَهُ .

بَكْدَمٌ, palmes vitis ; *it.* vitis ; varix.

بَلْ, *vide* **بَلْ**.

بَلْ, fut. **بَلْ** filum texuit.
Ethpe. **بَلْ** imminentus est.
Pa. **بَلْ** diminuit, imminent, levem, *inde* facilem reddidit ; *it.* specificavit, proprium fecit ; *cfr. ar.* **بَلْ** et **بَلْ** ; *it.* repudiavit.

Ethpa. **بَلْ** pass. imminentus fuit, paucus, rarus factus est, defecit ; *it.* specificatus est, nuncupatus est *cum vel sine* **وَ** cognominis.

Aph. **بَلْ** diminuit ; indicavit. **بَلْ**, subtegmen telæ, filum. **بَلْ**, repudium.

بَكْلَمٌ, p. pass. *Pe.* ; adj. levis, facilis.

بَكْلَمَةٌ, facile.

بَكْلَمَةٌ, facilitas.

بَكْلَمٌ, **بَكْلَمٌ** paucus, rarus.

بَكْلَمَةٌ, paucitas, tenuitas.

بَكْلَمَةٌ, paulo, raro.

بَكْلَمَنِي indicativus ; laxativus.

بَكْلَمَنِي restrictio ; indicatio.

بَكْلَمَنِي, *vide* **بَلْ**.

بَكْلَمٌ, fut. **بَكْلَمَ** stillavit.

Aph. **بَكْلَمَ** stillare fecit, stilatum fudit.

بَلْ stillatio, stillicidium,

بَلْ stillatio.

بَلْ et **بَلْ** δελφίνι, delphinus.

بَلْ, fut. **بَكْلَمَ** arsit, splenduit, ortus est.

Pa. **بَلْ** accedit.

Aph. **بَلْ** accedit ; *trop.* inflammat.

بَكْلَمَ actus fulgendi ; incendium.

بَلْ flamma, fulgor ; lampas, lucerna.

بَلْ cicendula (*gall.* ver-luisant).

بَلْ, *vide* **بَلْ**, contrarius fuit, litigavit, restitut.

بَلْ, i. q. **بَلْ**, *vide* sub **بَلْ**.

بَلْ, fut. **بَلْ** similis est.

بَلْ, **بَلْ** similis. **بَلْ** videtur.

بَلْ, **بَلْ** putat, censet... **بَلْ** **بَلْ** haud verisimile est.

Ethpe. **بَلْ** similis factus est.

Pa. **بَلْ** assimilavit, *seq.* **وَ** **بَلْ** imitatus est, representavit, figuravit ; opinatus est.

Ethpa. **بَلْ**, *sicut Ethpe.* - *it.* **بَلْ** imitatus est.

Ettaph. **بَلْ** *id.*

بَلْ similitudo, imago, species.

qualitas. typus. exemplum, exemplar; probabilitas, *in pl.* وَعَتْهُ, *st. c.* وَعَتْهُ. pretium.

وَعَتْهُ figurativus. idealis. وَعَتْهُ similiter.

وَعَدَ . وَعَدَ similitudo. species. phantasma. forma, figura, exemplum. exemplar; probabilitas. *pl.* وَعَتْهُ; *in st. const.* وَعَدَ: وَعَدَ ex omni specie. لَمَّا . وَعَدَ et لَمَّا كَذَّبَ siru, ad instar. وَعَتْهُ similitudinis modo.

وَعَدَ simul. similiter. specie tenus.

وَعَدَ similiudo. congruentia duarum rerum inter se. concordantia. *sæpe seq.* لَمَّا rel. وَجَّهَ.

وَعَدَ similis. ejusdem speciei. concordans.

وَعَدَ id.

وَعَدَ similitudo: conclusio. وَعَدَ imitans. imitator. figuratus, assimilatus. representativus.

وَعَدَ مِنْعَانِدَ per imitationem, per coniuram. per exemplum. وَعَدَ et لَمَّا وَعَدَ imitatio.

وَعَدَ وَعَنْ imitabilis. imitationis capax: imitari studens.

لَمَّا v. denom. a لَمَّا, re praesentavit, formavit; seq. وَعَدَ assimilavit.

لَمَّا وَعَدَ pass. assimilatus est, similis factus est.

وَعَدَ fut. بِعَدْ dormivit, recubuit, incubuit; concubuit, seq. حَتَّى vel لَمَّا; trop. negligit. incuriosus fuit, mansit; mortuus est.

Pa. وَعَدَ dormire fecit, recumbere fecit: trop. sopivit, extinxit, sedavit.

Ethpa. لَامَّا وَعَدَ sopitus est.

Aph. وَعَدَ ut Pa.

وَعَدَ dormitio.

وَعَدَ ، وَعَدَ dormiens, recumbens.

وَعَدَ somnus.

وَعَدَ ، وَعَدَ dormiens, somno deditus.

وَعَدَ ، وَعَدَ somnolentia, somnus.

وَعَدَ dormitio, concubitus; cubile, lectus. حَدَّ مِنْعَادَ dormitorium.

وَعَدَ ، وَعَدَ soporificus.

وَعَدَ - Pa. وَعَدَ cruentavit, vulneravit.

Aph. وَعَدَ id.

Palp. وَعَدَ sanguinem emisit; cruentus fuit.

Et palp. أَوْسِمْ أَوْسِمْ cruentatus est. sanguineo colore factus est.

أَوْسِمْ sanguis. pl. أَوْسِمْ : metaph. genus. succus. أَيْدِيَّاً : أَوْسِمْ vel أَوْسِمْ أَوْسِمْ haemorrhoidissa. أَيْدِيَّاً : أَوْسِمْ ruta sylvestris. أَوْسِمْ وَأَنْسَا sanguis draconis. planta. قَافَا وَأَوْسِمْ lapis haematites.

أَوْسِمْ sanguineus : trop. carna- lis.

أَوْسِمْ أَوْسِمْ et أَوْسِمْ أَوْسِمْ cruentus. أَوْسِمْ أَوْسِمْ sanguineus. rubicundus. أَوْسِمْ أَوْسِمْ et أَوْسِمْ أَوْسِمْ cruentus. sanguinolentus.

أَوْسِمْ domus. بَلْقَسْ .
Pz. أَوْسِمْ verb. denomi. domum adiuvavit.

أَوْسِمْ . pl. أَوْسِمْ dedit.
Pa. أَوْسِمْ abundantiter dedit.
أَوْسِمْ أَوْسِمْ lachryma. pl. أَوْسِمْ : trop. quidquid guta- tum stillat. خَدْ أَوْسِمْ exolu- rum anguli interni unde flui-unt lachrymæ.
أَوْسِمْ أَوْسِمْ lachrymula.

أَوْسِمْ - *Pa.* أَوْسِمْ admiratione affectit. admirationem movit.
Et pa. أَوْسِمْ admiratus est. obstupeuit.

Aph. أَوْسِمْ i. j. *Pz.*

أَوْسِمْ admiratio ; prodigium. res mirabilis.

أَوْسِمْ أَوْسِمْ أَوْسِمْ qual- itatem miram.

أَوْسِمْ أَوْسِمْ أَوْسِمْ mirabilis. mirus : i. soli- tarius. separatus. أَوْسِمْ أَوْسِمْ أَوْسِمْ res mira. prodigium. pl. أَوْسِمْ .

أَوْسِمْ أَوْسِمْ أَوْسِمْ mirabilis- ter.

أَوْسِمْ أَوْسِمْ solitudo. separatio.

أَوْسِمْ أَوْسِمْ mirus. mirabilis.

أَوْسِمْ أَوْسِمْ أَوْسِمْ mirus. admirationem provocans : i. sp. provoc. admirationem significans : mi- men pueri.

أَوْسِمْ أَوْسِمْ mirus. mirabilis.

أَوْسِمْ أَوْسِمْ أَوْسِمْ res mirabilis. prodigium. miraculum. pl. أَوْسِمْ .
أَوْسِمْ أَوْسِمْ أَوْسِمْ mirabiliter.

أَوْسِمْ . *fur.* أَوْسِمْ proprietas furi. appropinquavit. sed dilens. essensit.

Et pte. أَوْسِمْ *sunt Proba.* *et* parvus. *et* secundus *et* tertius *et* *quaternus.* *et* appropinquat. *et* dilens. *et* essens.

Aph. أَوْسِمْ appropinquare fecit. dilens : seq. *nei* et *laudili-* *bus* : *secundus* *tertius* *quar-* *tus*.

propinquitas ; *trop.*
obsequium.

الْهَادِيَةُ adhaesio; simulatio,
hypocrisis.

لِّجَنَةٌ, et **لِّجَنَةٌ** lagena, vas vinarium; cfr. ar. **لِّجَنَةٌ** et assyr. dannu; it. ramus arboris.

1^o, p^o cella vinaria.

טַבֵּן ? *inus.* in Peal; *cfr.* דָבֵב,
et **אַזְבָּן** *eauda.*

Pa. ظَبَّاٰ caudam fecit; inde
asseclam, infimum reddidit;
postposuit, humiliavit.

Ethpa. اُتْكَ pass. assecla,
infimus, contemptibilis factus
est.

وَهُدْجَةٌ وَهُدْجَةٌ cauda ; trop. pars extrema. دَرْجَةٌ وَهُدْجَةٌ postilena iumenti (*gall*, croupière)

وَهُنَّاكُمْ et
وَهُنَّاكُمْ

id. هَمْدَةٌ scorpiurus
herba seu heliotropium par-
xym.

Wāsi' cādam habens.

جَنْدِيٌّ, caudalis; trop. infimus,
contemptibilis.

agitavit, quassavit.

Ethpal. ﻮَبْلِ pass. ejusd.;
pependit, suspensus est.

Mrs, scolopendra.

وْلَمْ ؟ fut. بَنَتْ apparuit, ortus
 est ; trop. notus, clarus fac-
 tus est. Part. act. وَلَمْ ؟ oriens ;
 pass. وَلَمْ ؟ ortus ; adj. clarus.
 Aph. وَلَمْ ؟ oriri fecit, manifes-
 tavit, prodire feeit, elevavit ;
 narravit. propalavit.

Ethpa. لُّيْلَانْدُ clarus factus est,
apparuit.

أُرْتُسْ ortus, oriens, apparitio, manifestatio, splendor; pars zodiaci quae supra horizon- tem orientalem est. **أَرْتُسْ**; et

Epiphania Domini.
ortus, apparens,
fulgeus.

لَهُمْ، claritas.

مُبَيِّنٌ, manifeste, clare.

مدى أورiente Oriens

مَدْنَسْتَا *orientalis*, pl. مَدْنَسْتَات.

، fut. **كُوْتِهَمْ** cruciavit.

Pa. وَتْهِ id

Ethpa. ؤەپا pass.

جَعْلٌ، eruciatus.

دَائِنْقٌ، وَنَهْمًا et وَنَهْمًا، cfr. ar. دَائِنْقٌ،
et pers. دَائِنْقٌ، sexta pars dir-
hemi.

lōjō; cruciatus.

﴿ءَسْ﴾ - Ethpa. ﴿ءَسْ﴾
a δυσκολία, eunctatus est.

جذ، perdx.

جذ، pers نشک، manubrium.

جذ، vox persica, securis.

جذ، tympanum.

جذ، fut. بخ exstinctus est, occidit sol; periit, defecit, mortuus est.

Ethpe. جذ ut Pe.

Pa. جذ exstinxit, abolevit, perdidit.

Aph. جذ id.; it. sitim sedavit.

Ethpa. جذ exstinctus est; præteriit.

جذ exstinctio.

جذ exstinguibilis.

جذ exstinctus.

جذ et جذ exstinctio.

جذ exstinguens.

جذ fut. بخ plantavit, infixit; acu punxit, transfixit.

Ethpe. جذ pass.

Pa. جذ id. ac Peal.

جذ plantatio, infixio.

جذ fut. بخ pupugit, momordit, vexavit, læsit; trop. reprehendit, increpavit.

Pa. جذ terruit, turbavit; læsit oculum ita ut fleret, obœœcavit.

Ethpa. جذ pass.

جذ et جذ punctio, com-punctio, læsio.

جذ vexatus, spec. a daemone.

جذ percussus, affectus paralysi; claudus.

جذ litigiosus.

جذ fut. بخ sudavit; metaph. fatigatus est.

Pa. جذ sudavit multum, sudare fecit.

جذ c., pl. جذ sudor, labor; metaph. gummi arboris, spuma maris. جذ resina pini.

جذ et جذ sudans, sudore madens.

جذ latus hominis, lumbus; latus ædificii, arcuatum opus; feretrum, pl. جذ et جذ.

جذ διπάνη, viaticum. impensa, pl. جذ et جذ.

Pa. جذ verb. denom. impendit.

Ethpa. جذ pass.

جذ area, cista; feretrum, loculus.

جذ δαρνίδιον, laurus.

جذ, pl. جذ; it. جذ, ar. جذ, asser, tabula; gubernaculum navis; tabula scripta.

بِعْدَتْرَقْتَنْتَا et بِعْدَتْرَقْتَنْتَا cypressus.

بِعْدَتْرَقْتَنْتَا, fut. بِعْدَتْرَقْتَنْتَا abluit,
mundavit, cribravit triticum.

Ethpa. بِعْدَتْرَقْتَنْتَا pass.

بِعْدَتْرَقْتَنْتَا purgatio.

بِعْدَتْرَقْتَنْتَا, pl. بِعْدَتْرَقْتَنْتَا palma arbor.
بِعْدَتْرَقْتَنْتَا palmetum.

بِعْدَتْرَقْتَنْتَا palma una.

بِعْدَتْرَقْتَنْتَا, dimin. بِعْدَتْرَقْتَنْتَا, palmula,
in. pl. verrucæ.

بِعْدَتْرَقْتَنْتَا mentum; per extens.
barba. بِعْدَتْرَقْتَنْتَا جَانْفَتَنْتَا herba
caprina.

بِعْدَتْرَقْتَنْتَا barbatus.

بِعْدَتْرَقْتَنْتَا, pl. بِعْدَتْرَقْتَنْتَا caverna lat-
ronum. بِعْدَتْرَقْتَنْتَا وَوَهَمَتْرَقْتَنْتَا lupanar.

بِعْدَتْرَقْتَنْتَا δεκανός, decanus,
officialis, nuntius, tabellarius;
divisio astronomica.

بِعْدَتْرَقْتَنْتَا, fut. بِعْدَتْرَقْتَنْتَا, ar. دَقَّتْرَقْتَنْتَا, con-
tudit, comminuit.

Ethpe بِعْدَتْرَقْتَنْتَا pass.

Pa. بِعْدَتْرَقْتَنْتَا valde comminuit,
contrivit.

Ethpa. بِعْدَتْرَقْتَنْتَا pass.

Palp. بِعْدَتْرَقْتَنْتَا id. q. Pa.

Ethpalp. بِعْدَتْرَقْتَنْتَا pass.

بِعْدَتْرَقْتَنْتَا tenuitas; vadum.

بِعْدَتْرَقْتَنْتَا legumina, olera.

بِعْدَتْرَقْتَنْتَا, pl. بِعْدَتْرَقْتَنْتَا id.

بِعْدَتْرَقْتَنْتَا, بِعْدَتْرَقْتَنْتَا parvus, tenuis;

بِعْدَتْرَقْتَنْتَا trop. plebeius, pl. بِعْدَتْرَقْتَنْتَا res parvi momenti.

بِعْدَتْرَقْتَنْتَا part. pass. Pe. commi-
nutus; adj. tenuis, parvus.

بِعْدَتْرَقْتَنْتَا tenuitas.

بِعْدَتْرَقْتَنْتَا vel بِعْدَتْرَقْتَنْتَا pulvis, pulvisci-
lus.

بِعْدَتْرَقْتَنْتَا vel بِعْدَتْرَقْتَنْتَا mortarium.

بِعْدَتْرَقْتَنْتَا, fut. بِعْدَتْرَقْتَنْتَا et بِعْدَتْرَقْتَنْتَا feriit,
pupugit, transfixit hasta vel
gladio, impetivit cornu.

Ethpe بِعْدَتْرَقْتَنْتَا pass.

Pa. بِعْدَتْرَقْتَنْتَا impetivit cornu; me-
taph. convitiatus est.

Ettaph. بِعْدَتْرَقْتَنْتَا id.; seq. حَسْنَة pugnavit.

بِعْدَتْرَقْتَنْتَا percussio.

بِعْدَتْرَقْتَنْتَا perfossio; pleuresis.

بِعْدَتْرَقْتَنْتَا et بِعْدَتْرَقْتَنْتَا impetens cornu.

بِعْدَتْرَقْتَنْتَا colaphus, ictus.

بِعْدَتْرَقْتَنْتَا ictus, verberatio.

بِعْدَتْرَقْتَنْتَا lectus, cunæ.

بِعْدَتْرَقْتَنْتَا, fut. بِعْدَتْرَقْتَنْتَا, ar. ذَرَى, spar-
sit, dispersit, ventilavit.

Pa. بِعْدَتْرَقْتَنْتَا id.

Ettaph. بِعْدَتْرَقْتَنْتَا ventilatus est.

بِعْدَتْرَقْتَنْتَا, بِعْدَتْرَقْتَنْتَا dispersio, ventila-
tio.

بِعْدَتْرَقْتَنْتَا ventilator, pl. بِعْدَتْرَقْتَنْتَا venti pulverem abripienes.

بِعْدَتْرَقْتَنْتَا, pl. بِعْدَتْرَقْتَنْتَا ventilabrum.

مَوْفِتَلٌ ventilator; *trop.* dispersens, dissipans.

جَادَةٌ , ar. جَادَةٌ , via.

جَادَ - *Pa.* **جَادَ** *verb. denom.*
gradum fecit ad, gressus est,
promovit ad; dispositus per
gradus.

Ethpa. **جَادَلَ** *pass.* et *reflex.*
promotus est, se promovit,
ascendit; ad ordines sacros
promotus est.

Aph. **جَادَلَ** gradatim adduxit.
جَادَ, **كَلْبَةٌ** gradus, scala; *metaph.* conditio, classis, ordo,
officium. **جَادَ** **مَعْنَى** **جَادَ** et
جَادَ **كَلْبَةٌ** **جَادَ** per gradum,
gradatim.

كَلْبَةٌ gradus, progressus per
gradus.

كَلْبَةٌ et **كَلْبَةٌ**, ar. دَرَاجٌ, franco-
linus.

مَوْفَتَلٌ gradatim promotus.

مَوْفَتَلٌ gradatim.

لَكْتُوسٌ, pl. **لَكْتُوكَمَادَةٌ** lectus,
stratum, cunæ.

لَكْتُوكَمَادَةٌ vultur; *it.* (*vel* potius **لَكْتُوكَمَادَةٌ**)
ulmus.

لَكْتُوكَمَادَةٌ fæce maculavit.

لَكْتُوكَمَادَةٌ puer; *metaph.* vilis, pl.
لَكْتُوكَمَادَةٌ.

مَهَدَّةٌ , pl. مَهَادَّةٌ id.

مَهَادَّةٌ diminut. puerulus.

جَبَدَةٌ et جَبَدَةٌ , pl. جَبَدَةٌ tribulus,
spina. *it.* ulmus; *cfr.* pers.
ارbor culicum: ulmus.

مَهَادَّةٌ minus recte pro مَهَادَّةٌ
proboscis elephantis.

سَارْتُورٌ sartor.

أَرْسَارْتُورٌ ars sartoris.

حَافَّةٌ δοράτιον, hasta, lancea.

جَادَ et جَادَ , fut. جَادَ gressus
est, calcavit, subegit; c. كَ
لَوْيَ ingressus est; c. كَ
لَوْيَ rei transgressus est.

Ethpe. **جَادَلَ** *pass.* - *trop.* com-
prehensus est, mente percep-
tus est; corruptus est.

Aph. **جَادَلَ** assecutus est, at-
tigit; potuit; intellexit, cog-
novit; maturitatem attigit;
trituravit.

Ettaph. **جَادَلَلَ** comprehensus
est.

تَرْتِيلَةٌ et تَرْتِيلَةٌ tritura, cal-
catio, gradus; apprehensio.

تَرْتِيلَةٌ calcatio, inde passus,
vestigium, pl. تَرْتِيلَةٌ .

تَرْتِيلَةٌ , pl. تَرْتِيلَةٌ ,
concupina, famula; surculus.

تَرْتِيلَةٌ apprehensus; *it.* gradiens.

سَبَقْتُمْ حَمَلًا stabilitas.

مَبْعَدْتُمْ حَمَلًا via, semita; gradus, limen ostii; area.

مَبْعَدْتُمْ qui deprehendit, qui intelligit.

مَبْعَدْتُمْ deprehensio; adeptio.

مَدْعَوْدَتُمْ comprehensibilis, qui attingi vel deprehendi potest.

مَدْعَوْدَتُمْ adv.; c. ۱ incomprehensibiliter.

مَدْعَوْدَتُمْ comprehensibilitas, comprehensio. مَدْعَوْدَتُمْ ۱ incomprehensibilitas.

مَدْعَدَمْ daricus moneta regalis, a pers. دارا rex.

مَدْعَدَمْ δραχμή, drachma.

مَدْعَمْ , pers. درمان , remedium, cataplasma.

مَدْعَمْ navis levis, δρόμων .

مَدْعَمْ astutia, calliditas.

مَدْعَمْ , مَدْعَمْ astutus, deceptor; it. corruptus, improbus.

مَدْعَمْ dolus, improbitas, prævaricatio; it. barbaries sermonis.

مَدْعَمْ , fut. مَدْعَمْ mensuravit.

Pa. مَدْعَمْ brachio impulsit; trop. rexit, gubernavit.

Aph. مَدْعَمْ brachio tulit.

مَدْعَمْ armus, brachium; mensura cubiti; metaph. vis; cfr.

كَهْ وَهُمْ حَمَلًا ar. ذراء . ذرائعا . ذرائعا . brachiale. tunica e lana confecta.

جِهَادٌ , pers. درش , vexillum.

جِهَادٌ , pers. دارصيني , cinnamonum.

جِهَادٌ , cfr. δωρακινόν et ar. ذراق , mala persica.

جِهَادٌ جِهَادٌ δράκον δracos.

جِهَادٌ , fut. شَهَادَهْ pugnavit cum, seq. acc. vel حَمَلْ pers.

Pa. جِهَادٌ id.

Ethpa. جِهَادٌ لِّ id.

جِهَادٌ et جِهَادٌ لِّ certamen, bellum.

جِهَادٌ حَذَرْنَا adversarius, hostis.

جِهَادٌ et جِهَادٌ لِّ certamen, bellum, lucta.

جِهَادٌ pugnans, athleta.

جِهَادٌ لِّ ars pugnandi, eertamen.

جِهَادٌ , fut. بَهَادَهْ , ar. trivit, calcavit, stravit viam; trop. studuit, inquisivit; c. ۱ vel بَهَادَهْ disputavit, examinavit.

Pa. جِهَادٌ id; insuper domuit, erudit, educavit.

Ethpa. جِهَادٌ pass. et reflex. tritus est; disputatus est, exercitatus est, se excoluit.

جِهَادٌ tritura, calcatio.

جِهَادٌ , id; trop. studium, disputatio; حَسَدْ حَسَدْ schola.

جِهَادٌ helleborus.

disputator, sophista.	de quo disputatur, am-
polemicus, dialecticus.	biguuus.
polemice.	exercendus.
exercitatio, disputatio ; educatio, disciplina.	donum, munus.
palaestra.	<i>Pa.</i> v. <i>den.</i> munus, donum obtulit.
hymnus ; commentarium ; <i>cfr. heb.</i> interpretatio.	<i>Ethpa.</i> dono gratificatus est.
schola ; <i>cfr. ar.</i> .	<i>et</i> <i>aegilops herba</i> ; <i>cfr. ar. et pers.</i> .
exercens, docens ; <i>it.</i> controversus.	<i>ل</i> , jus, decretum, sententia ; <i>cfr. heb.</i> <i>et pers.</i> داد edictum, lex.
exercitatio ; ars rhetorica.	

1

o litera quinta alphabeti; est
pronomin. 3æ pers. masc. et
fem. nominibus, verbis et
particulis suffixum; indicat
abbreviationem vocis αλλελουα
id est; ὁ ἡ compendiosa
est scriptio: ἀλλελουα ἀλλελουα
alleluia et alleluia; numerice
valet: o vel ὁ = 5, ὅ =
quintus. etc.; cfr. priores
litteras. -οι et ο facile inter se
permutant, v. g. οὐδὲν et οὐτόν;
χάρι et οὐδέν; -in pronunciatione
οι sœpe tacet: οὐδένι ego sum;
imo in inscriptione cadit. οὐτόν
pro οι βίστι.

lōi part. demonstr. en, ecce.
 lōi م ab hoc, hinc. lōi qui
 hic, ibi, quod ecce, qui jam ;
 præc. ن, interrogativum est :
 nonne ? ; c. adv. temporis :
 لـ in posterum.
 لـ م abhinc, exinde.
 لـ م abhinc et
 porro.

دَحْنَةٌ et **دَحْنَاتٍ**, pl. **دَحْنَاتٍ** et

أَبْرَيلٌ flos; cfr. أَبْرَيلٌ وَمِنْسِيٌّ. *mensis florum*: Aprilis.

Pa. حَدَّ v. *den.* floruit; nituit,
splenduit. *Part. act.* حَدَّاء
florens. *Part. pass.* مَهْدَى
ornatus, vestitus.

ଶ୍ରୀ splendor, ornamentum, decus.

سَلْيَنْدَنْدَنْ splendide.
فَلَوْنَدَنْدَنْ flos, venustas, splen-
 dor.

L 298 adversarius, inimicus, *plerumque* Satanus; invidus.

~~100~~ odium, invidia.

۲۰۱, **۲۰۲** pulvisculus,
atomus; vanitas.

وَهُنَّاكِيْنَ vanus.

وَنِعْمَةٌ حَلْكَةٌ vanitas.

أَحْدَاثٌ, **أَكْلَمَاتٌ** et **أَكْلَمَاتٍ**, pl.
أَحْدَاثٌ grex camelorum vel
 porcorum; cfr. **أَحْدَاثٌ**.

ԱՆ vapor; custos armentorum.

لَوْمَةٌ, fut. **لَوْمَةٌ** meditatus est, cogitavit.

Pa. **لَوْمَةٌ**, ar. هَجَرَ, literas pronuntiavit, eas vocalibus instruxit.

Ethpa. **لَوْمَلِ** pass. meditatus est; in animo habuit ut; literas syllabatim conjunxit.

لَوْمَةٌ meditatio; dolor.

لَوْمَةٌ meditatio; literarum appellatio, alphabetum, syllaba, syllabarum conjunctio et pronunciatio; lectio.

لَوْمَةٌ meditatio, exercitatio; educatio.

لَوْمَهُمْ lectionem docens, magister; lineola literis quiescentibus subscripta easque semivocalibus, ad instar schewæ mobilis, instruens; ex. g.: **سَهْلَمْ**.

لَوْمَهُمْ hujusmodi lineolæ additio.

لَوْمَةٌ - *Pa.* **لَوْمَةٌ** imaginatus est.

Ethpa. **لَوْمَلِ** repræsentatus est; imaginatus est, meditatus est.

Aph. **لَوْمَلِ** ut *Pa.*

لَوْمَةٌ delirium.

لَوْمَةٌ et **لَوْمَةٌ** idea, imaginatio, vis imaginandi.

لَوْمَةٌ, f. **لَوْمَةٌ** phantasma; in f. fantasmagoria.

لَوْمَةٌ phantastice.

لَوْمَةٌ phantasma; hæresis Phantasiastarum.

لَوْمَةٌ et **لَوْمَةٌ** phantasticus; Phantasiasta.

لَوْمَةٌ fictio.

لَوْمَةٌ imaginativus.

لَوْمَةٌ facultas imaginativa; imaginatio.

لَوْمَةٌ, fut. **لَوْمَةٌ** evertit, diruit.

Ethpe. **لَوْمَلِ** pass.

Pa. **لَوْمَةٌ** funditus evertit.

لَوْمَةٌ eversio, dirutio.

لَوْمَهُمْ et **لَوْمَهُمْ** رَجُلُونَ, præfector, præses, dux, judex.

لَوْمَهُمْ præfectura.

لَوْمَلِ v. *denom.* præfector, judex factus est.

لَوْمَةٌ et **لَوْمَةٌ**, f. **لَوْمَةٌ**; it **لَوْمَةٌ**, f. **لَوْمَةٌ**, ar. حَمَّدَ, dromadarius.

لَوْمَةٌ ex ignobiliori matre natus servus, equus; inde spurius.

الْإِسْلَامِيُّونُ Islamismus.

Aph. اَنْوَارٌ verb. denom. ab

انْوَارٍ Agar, Islamismo nomen dedit.

Ethpa. اَنْوَارٌ id.

مُهَمَّدٌ وَمُحَمَّدٌ et مُهَمَّدٌ Mahumeta-nus.

مُهَاجَرَةٌ ut اَنْوَارٌ ; it., ar. هِجْرَةٌ Mahumetis fuga., he-gira.

اَخْرَجَ اَخْرَجَ ، fut. اَخْرَجَ ، ar. هَدَىٰ duxit, direxit; usitat. tantum in part. act.; it. deliravit, ar. هَدَىٰ .

Pa. اَخْرَجَ duxit, induxit, viam demonstravit.

Ethpa. اَخْرَجَ اَخْرَجَ pass. et reflex.

مُهَاجَرَةٌ et مُهَاجَرَةٌ directio.

مُهَاجَرَةٌ et مُهَاجَرَةٌ dux, director; magister.

مُهَاجَرَةٌ et مُهَاجَرَةٌ ductus.

مُهَاجَرَةٌ ducens.

مُهَاجَرَةٌ directio.

مُهَاجَرَةٌ ductio, directio.

مُهَاجَرَةٌ ، مُهَاجَرَةٌ dirigens; dux; f. اَخْرَجَ .

مُهَاجَرَةٌ directio.

مُهَاجَرَةٌ dirigendus.

عُجَّلٌ ، اَسْبَقَ ، v. سُبَقَ .

مُهَاجَرَةٌ ، اَنْوَارٌ لَّذِيْغَزْ ، ple-beius; simplex, ignarus, im-

becillis ingenio, ignotus, f.

اَنْوَارٌ .

اَنْوَارٌ وَمُهَاجَرَةٌ ignorantia, simplici-tas, stultitia.

اَنْوَارٌ وَمُهَاجَرَةٌ more plebeiorum, modo simplici, insulso.

مَهْمَّةٌ ، pl. مَهْمَّاتٌ membrum; trop. sectio, membrum oratio-nis ; اَنْوَارٌ اَنْوَارٌ frustatim, membratim.

مَهْمَّةٌ dimin. parvum mem-brum.

Pa. اَنْوَارٌ verb. denom. membra-tim secavit, in frusta concidit.

Ethpa. اَنْوَارٌ اَنْوَارٌ pass. ; it. mem-bris coagmentatus est.

مَهْمَّةٌ fut. مَهْمَّةٌ confabu-latus est; meditatus est. trop. studuit c. اَنْ rei ; cona-tus est.

Pa. مَهْمَّةٌ animum adjecit ad, c. اَنْ vel اَنْ ; se oblectavit in re.

مَهْمَّةٌ meditatio.

مَهْمَّةٌ garruliter.

مَهْمَّةٌ cogitatio, meditatio; confabulatio, delirium.

مَهْمَّةٌ — Part. pass. اَنْوَارٌ ، اَنْوَارٌ ornatus. — adj. deco-rus, magnificus, gloriosus, venerandus.

Pa. چوں ornavit, honorificavit, glorificavit.

Ethpa. چوں لی pass. et reflex.

چوں ، چوں decus, gloria : podex, gr. ἔδρα.

لَوْمَةٌ splendor, decus, gravitas, magnificentia.

كُوْنَةٌ cum splendore.

كُوْنَةٌ decor.

لَوْمَةٌ ornator, laudator.

مُوْنَجَةٌ ڦڏڙخُلِيٰ، organum.

ك

۰۱ , f. بُنِيٰ, pronom. 3rd pers. is, ipse, ipsa ; pl. بُنِيٰ , f. بُنِيٰ .

1^o. — *forma enclit. est in sing.* ۰۱ m. et بُنِيٰ f. et per او *occultationem* او ، بُنِيٰ ; pl. بُنِيٰ , f. بُنِيٰ , *permutata او in l* ; *hæc forma locum tenet verbi subst.* : بُنِيٰ ۰۱ اُنِيٰ ego sum filius tuus. ۰۱ اُنِيٰ tu es, f. بُنِيٰ اُنِيٰ tu es ; ۰۱ ۰۱ et *plurimumque* بُنِيٰ ipse est, بُنِيٰ بُنِيٰ *vel* بُنِيٰ ipsa est, بُنِيٰ اُنِيٰ vos estis, etc., ۰۱ بُنِيٰ ibi est. بُنِيٰ est nnq. pro ۰۱ بُنِيٰ .

2^o. — *forma enclit. plur. adhibetur etiam pro objecto vel accusat.* ex. : اُنِيٰ بُنِيٰ occidit eos.

3^o. — *præc.* ، *hæc pronomina vim habent relativi et*

indefiniti, ex : ۰۱ qui, اُنِيٰ ۰۱ quicumque, ۰۱ بُنِيٰ id.

4^o. ۰۱ بُنِيٰ ۰۱ etc. *aequivalet pronomini reflexivo = idem, ipse idem* ; بُنِيٰ بُنِيٰ بُنِيٰ eadem. اُنِيٰ ۰۱ ipse sibi, poet. *pro* حَتَّفَهُ ۰۱ .

5^o. — ۰۱ *respondet articulo :* بُنِيٰ ۰۱ و 'Iγσωνε.

لَوْمَةٌ status, identitas ; essentia, forma.

لَوْمَةٌ مَدْعَةٌ identitas, singularitas.

لَوْمَةٌ مَدْعَةٌ ejusdem naturæ.

لَوْمَةٌ مَدْعَةٌ eodem modo.

۰۱ , ex ۰۱ et ۱۰۱ f. بُنِيٰ .

1^o. *pron. demonstr.* ille, illa, illud ; pl. بُنِيٰ , raro بُنِيٰ et بُنِيٰ , f. بُنِيٰ , ex بُنِيٰ ۱۰۱ , بُنِيٰ ۱۰۱ , illi, illæ, illa.

2^o. *adject. demonstr.* e. g. : ۰۱ بُنِيٰ ille homo, اُنِيٰ بُنِيٰ vel بُنِيٰ illa regio.

3^o. *ponuntur pro articulo :* بُنِيٰ ۰۱ و 'Iγσωνε. regulus ; بُنِيٰ و 'Iγσωنے اُنِيٰ captivi (les captifs).

4^o. *c. relat.* ; ۰۱ ille qui, ۰۱ بُنِيٰ illa quæ, etc. ; بُنِيٰ بُنِيٰ in qua ; ۰۱ بُنِيٰ sieut is qui, utpote qui. ۰۱ بُنِيٰ eo quod, propterea quod ; ۰۱ بُنِيٰ

id. لَمْ يَمْكُرْ لَمْ يَمْكُرْ quantum fieri potest.

لَوْلَى, fut. لَوْلَى, apoc. cum sensu subjunctivi لَوْلَى, لَوْلَى etc, fuit; factus est, exstitit; accidit; impers. اَتَ لَوْلَى contigit; c. suff. وَلَوْلَى, يَلَوْلَى; in fut. مَلَوْلَى, etc. - لَوْلَى auxiliare est et enclitice adhibitum cum occultato et in sensu: fuit, quando ponitur post predicatum vel locutionem quamcumque quae vim habet attributi: اَنْ كَهْ لَوْلَى si fuisses hic. — nng. otiosum est, ut plerumque post يَلَوْلَى; لَوْلَى يَلَوْلَى يَلَوْلَى non erat ibi; - præc. partic., لَوْلَى respondet imperfecto. لَوْلَى يَلَوْلَى noverat; it. præced. perfecto, respondet perfecto: vel saepius, plusquam perfect. دَوْلَى لَهْلَمْلَى dixi; اَنْ كَهْ لَوْلَى يَلَوْلَى, apprehenderat Joannem; - in prop. subord., لَوْلَى præc., subjunctivum significat. حَوْلَى مَلَوْلَى يَلَوْلَى eos orare volo - لَوْلَى دَلَلَ erat. Part. act. لَوْلَى, مَلَوْلَى; pl. مَلَوْلَى, f. مَلَوْلَى, est, sit. Part. pass. لَوْلَى, لَوْلَى, emph. مَلَوْلَى; pl. مَلَوْلَى, emph. لَوْلَى, factus, creatus,

existans; in pl. emph. res creatæ.

Varii sunt usus لَوْلَى pro variis partic. اَنْ كَهْ لَوْلَى sequutus est eum; seq. سَكَفْ = successit; seq. مَسْكَفْ = possess. significat: habuit; seq. مَسْكَفْ = servivit, etc. Aph. مَدْلَلْ existere fecit, creavit.

Ettaph. مَدْلَلْ esse seu existentiam accepit, creatus est.

لَوْلَى, مَلَوْلَى, pl. مَلَوْلَى nativitas, generatio; existentia; creatio, res creatæ.

مَلَوْلَى create.

مَلَوْلَى creatio.

مَلَوْلَى, مَلَوْلَى, pl. مَلَوْلَى adj. verb. id. q. لَوْلَى, مَلَوْلَى.

مَلَوْلَى id. q. مَلَوْلَى.

مَلَوْلَى existere faciens; creator.

مَلَوْلَى actio creandi.

مَلَوْلَى creabilitas.

مَلَوْلَى partic. exclam. heu! vae! age!

مَلَوْلَى مَلَوْلَى هَيْكِنْثُوس hyacinthus lapis.

مَلَوْلَى, et مَلَوْلَى, f., pl. مَلَوْلَى مَلَوْلَى et مَلَوْلَى بَلَجْ, materia, abyssus, chaos. مَلَوْلَى مَلَوْلَى ligna. مَلَوْلَى et مَلَوْلَى materialis.

الْمَكْوَنُ et الْمَكْوَنُ materia-
litas.

الْمَهْمَنْتُ الْمَعْسُورُ، consub-
stantialis.

الْمَنْ، in st. constr. الْمَنْ et الْمَنْ،
intellectus, mens, intelligentia;
trop. opinio, significatio;
dogma. الْمَنْ الْمَنْ intellectus passivus.
الْمَنْ الْمَنْ intellectus activus.
الْمَنْ الْمَنْ intellectus acquisitus. الْمَنْ الْمَنْ
ad se rediit, mentis potens fuit. الْمَنْ الْمَنْ id. الْمَنْ
impotens animi fuit, amens factus est.

Pa. الْمَنْ – Part. pass. الْمَنْ،
الْمَنْ mente prædictus; adj.
intelligens, sapiens.

Ethpa. الْمَنْ intelligens factus
est, sapuit, mentem recuperavit;
intellectus est.

Pal. الْمَنْ mente tenuit, recordatus
est; prudenter egit.

Ethpalp. الْمَنْ sapuit, re-
sipuit; cogitavit, prudenter
egit; recordatus est; pass.
intellectus est. Part. pass.
الْمَنْ mente perceptus.

الْمَنْ sapienter.

الْمَنْ fortis.

الْمَنْ et الْمَنْ intellectus,
intelligentia.

الْمَنْ sapienter.

الْمَنْ f. emph.

الْمَنْ sapiens, pru-
dens, intellectualis, spiritualis.

الْمَنْ virtutes intel-
lectuales: angeli.

الْمَنْ sapienter, intelligentia.

الْمَنْ intellectus, intelligentia.

الْمَنْ flatus, halitus, spiri-
tus; vapor; trop. breve tem-
poris spatium.

الْمَنْ pl. الْمَنْ et
الْمَنْ subdiaconus.

الْمَنْ officium subdiaconi.

الْمَنْ pl. الْمَنْ
consul.

الْمَنْ consulatus.

الْمَنْ الْمَنْ praefectus,
judex, pl. الْمَنْ.

الْمَنْ الْمَنْ praefectus.

الْمَنْ provincea, praefectura;
diæcesis, pl. الْمَنْ

الْمَنْ ar. هَرْ، pl. الْمَنْ et الْمَنْ
abyssus.

الْمَنْ genus piscium.

لِّيْلَ fel rubrum.

لِّيْلَ spina; cfr. لِّيْلَ, ar. أَطْلَأْ.
لِّيْلَ, وَلَ et derivata v. s. ٣٠.

لِّيْلَ, confl. ex لِّيْلَ et بِعْدَ,
id. q. بِعْدَ.

لِّيْلَ rel. لِّيْلَ لِّيْلَ, comp. ex لِّيْلَ
et بِعْدَ, tunc, tum, deinde.
لِّيْلَ بِعْدَ exinde, ex illo tem-
pori. بِعْدَ تَمَّاً usque
tunc.

لِّيْلَ et لِّيْلَ بِعْدَ, v.
s. ٣٠.

لِّيْلَ حَلْلَةً aedificium, palatium;
templum. لِّيْلَ
لِّيْلَ templum lucis: celum.
لِّيْلَ لِّيْلَ templum Dei:
Beata Virgo.

لِّيْلَ et لِّيْلَ id. q. ٦٠.

لِّيْلَ, v. sub بِعْدَ.

لِّيْلَ, لِّيْلَ adv. loci, hic, ibi.
لِّيْلَ adv. sic, ita, pariter, tot.
لِّيْلَ, ex لِّيْلَ et لِّيْلَ, adv. tem-
poris nunc, tune; ergo, enim.
لِّيْلَ, تَمَّاً ita, sic, pariter, tali
modo; res talis, hujusmodi.
لِّيْلَ... لِّيْلَ quemadmodum...
ita. لِّيْلَ... لِّيْلَ id. لِّيْلَ...
ita ut, adeo ut. لِّيْلَ sic, ita.
لِّيْلَ, دُهْدَهْ postea. لِّيْلَ لِّيْلَ

et لِّيْلَ propterea, quare.
لِّيْلَ exinde, deinceps,
لِّيْلَ non sic, aliter.

لِّيْلَ, fut. نَسْكَهْ inania
meditatus est, deliravit; stre-
pitum edidit; cfr. نَفَرَ.
لِّيْلَ clamor, tumultus.

لِّيْلَ semper c. procl. لِّيْلَ, illuc,
procul, supra, ultra, longius;
procul a; praeter. لِّيْلَ لِّيْلَ
huc et illuc. لِّيْلَ مُخَالَفَهْ
abhinc et ultra. لِّيْلَ وَلِّيْلَ
judicium futurum. لِّيْلَ وَلِّيْلَ
mundus ulterior.

لِّيْلَ verb. denom. removit.
لِّيْلَ removit; mutatio.
لِّيْلَ, v. s. لِّيْلَ.

لِّيْلَ Pa. لِّيْلَ gressus fuit,
incessit; discessit, periit;
trop. tali agendi ratione usus
est. — it. ambulare fecit,
duxit.

Ethpa. لِّيْلَ perlustratus est.
لِّيْلَ incessus, ambula-
tio, cursus.

لِّيْلَ et لِّيْلَ id., pl. لِّيْلَ;
trop. mores. لِّيْلَ دَهْ am-
bulacrum.

لِّيْلَ incedens, ambulans,
prorepens.

رَّبِيعٌ rapidus, velox.

رَّبِيعٌ rapide, festinanter.

رَّبِيعٌ fluens, profluens *oratio*.

رَّبِيعٌ ambulatio.

رَّبِيعٌ gradiens.

رَّبِيعٌ pervius; *trop.* possibilis.

رَّبِيعٌ status rei perviae.

۳۰۰ Pe. inus.

Pa. رَّبِيعٌ laudavit, cantu celebravit.

Ethpa. رَّبِيعٌ pass.; *it.* irrisus est.

Aph. رَّبِيعٌ sprevit, irriguit, *c.* ۷
vel ۸.

Ettaph رَّبِيعٌ derisus est.

رَّبِيعٌ jubilatio, cantus.

رَّبِيعٌ alleluia, *heb.* הַלְלוּיָה
laudate Deum.

رَّبِيعٌ derisor.

رَّبِيعٌ derisorie.

رَّبِيعٌ derisorius.

رَّبِيعٌ irrisio.

رَّبِيعٌ et رَّبِيعٌ derisio, contemptus.

رَّبِيعٌ irrisorius.

رَّبِيعٌ velum capitum ad usum episcoporum græcorum.

رَّبِيعٌ, pl. رَّبِيعٌ ornamenta, opera cœlata, reticulata.

رَّبِيعٌ id.

۳۰۰ — *Aph.* رَّبِيعٌ avertit

oculos, animum, destitit a, neglexit, reliquit, *c.* ۷; permisit, toleravit, *c.* ۷; moratus est. *Part.* رَّبِيعٌ, رَّبِيعٌ negligens.

Ettaph. رَّبِيعٌ negligens; neglectus est.

رَّبِيعٌ negligens, neglectus.

رَّبِيعٌ negligenter.

رَّبِيعٌ negligentia.

رَّبِيعٌ, pers. حَمِيَان, zona, cingulus, balteus, pera.

رَّبِيعٌ, ex ۱۰, ۷ et ۷, hinc, exinde.

رَّبِيعٌ f. sepulchrum; inferi.

رَّبِيعٌ, γῆ mensura capacatis (dimidia pars sextarii).

رَّبِيعٌ, et رَّبِيعٌ torques, monile.

۳۰۰ , fut. رَّبِيعٌ meditatus est, *c.* ۷ *rei*; studuit, petiit, *c.* ۷ *rei* vel seq. fut., inde impugnavit, *c.* ۷; *it.* tetigit; ausus est.

Aph. رَّبِيعٌ dubitare, contendere fecit; fatigavit.

رَّبِيعٌ et رَّبِيعٌ meditatio, studium, cura; contactus.

رَّبِيعٌ meditatio.

رَّبِيعٌ, سُرِّعَادٌ scrutator.

ἵμοι ῥυέρχ, dies.

οὐδὲν δύναείχει, obses; pignus,
pl. οὐδέτερα et οὐδέποτε.

۱۰۱، مُنْ (contr. ex لَوْلَيْتَ وَ inus. مُنْ)،
 f. لَوْلَيْتَ، f. لَوْلَيْتَ، et raro مُنْ، et c.
 enclit. مُنْ لَوْلَيْتَ (ex لَوْلَيْتَ et لَوْلَيْتَ)؛
 pl. c. مُنْ (ex لَوْلَيْتَ et مُنْ) et
 raro مُنْ وَمُنْ، pron.
 demonst. hic, iste, istud, talis; pl. isti, istae, ista; adjec.
 اَهْنَ مُنْ، vel اَهْنَ مُنْ hoc tempus;
 c. relat. ؟، ؟، مُنْ hi qui;
 respondet nng. artic. грæco:
 اَهْنَ وَمُنْ مُنْ ol λέγοντες؛ اَهْنَ
 (contr. ex مُنْ et مُنْ)، hic est,
 hoc est; اَهْنَ اَهْنَ scilicet, nem-
 pe; مُنْ مُنْ talis; اَهْنَ اَهْنَ vel
 مُنْ مُنْ، tales, ejus-
 modi. مُنْ اَهْنَ، tanto, tan-
 tum; adeo ut; tantus.

Lo, fut. **l**or gratus fuit,
placuit, profuit.

Ethpe. ωντι utilitatem, voluptatem percepit.

Ethpa. ସ୍ଵର୍ଗି id.

Aph. ወጤት በለታች; በሩጻት.

*Part. lōo lōo gratus,
utilis.*

欢，乐 usus, utilitas,
voluptas.

سَّوْدَنْ, إِلْسَوْدَنْ suavis, gratus.

جُنْدَةٌ jucunde.

Lōwōn et **Lōwōn**, pl., **Lōwōn**
suavitas, voluptas.

lūsor,ō utilis, gratus.

جَنْحَةٌ *fabrile scalprum.*

مَدْبُرٌ ἔνδημία, morbus endemicus.

بَرْبَرْهُمْ ، ar. حَنْدَقُوقْ ، melilotus cæruleus.

4001, v. s. 001.

אַרְבָּה ἡγίοχος, auriga.

ajor, major et minor, v. s. 001

ڦڻ, fut. ڦڻ, versavit,
convertit, mutavit; pervertit.
evertit, subvertit; *intrans.*
se vertit, conversus est; re-
versus est; *trop.* resipuit; *c.*
ڻ *rei*, inconstans fuit, fidem
fefellit, *ar.* آڻت; *c.* ۾ rever-

sus est; c. אֶתaversus est;
avertit se, *inde deseruit*; -
seq. *alio verbo*, *significat*:
denuo, rursus, *ut heb.* בָּשָׁ:

iterum manducavit. Part.

act. مُفْتَحٌ, مُفْتَحًا convertens,
etc.; *it.* se convertens, *etc.*; *ad-*
verb. *seq.* *al. verbo*, iterum.

Ethpe. **عُولِي** *pass. et reflex.*

Pa. γένοι *ut Pe.* in sens. act.

فَحْمَه مُتَلِّه حَمَه سَبِيلًا verba
inter se commutaverunt.

Ethpa. فَرْكَلِي pass. et reflex. ut
Ethpe. ; it. trop. versatus
est, volutatus est, egit ; c. مُنْ
defecit. حَنْدَكَمَا اِنْفَرْكَه حَمَه فَرْ
dolose egit cum aliquo.

Aph. فَرْكَلِي ut *Pe.* in sensu
act. ; it. circumegit, redire
fecit, retulit, reddidit ; trop.
respondit, objecit ; it. in ali-
am linguam transtulit c. ۷۰.
فَرْكَه اِنْفَرْكَه بَقْتَه بَقْتَه
negavit petitionem alicujus ; فَرْكَه مُنْ
deseruit.

Ettaph. فَرْكَلَلِي restitutus est.
فَرْكَه, فَعْلَه, inversio, contra-
rium ; c. ح vel ۷۰, in contra-
rium, e converso.

فَحَدَه reversio.

فَحَنَه inversio, aversio, con-
torsio sermonis ; subversio ;
contrarium.

فَحَدَه reversio, reditus ; inver-
sio, aversio ; pl. فَخَنَه re-
torsiones, responsa ; antiphonae.
حَنْدَه وَمَهْدَه die
sequenti.

فَهَدَه excidium, subversio ;
inversio, retrogressus.

فَهَدَه part. pass. *Pe.* -
adj. perversus.

فَهَدَه contrarie.

فَحَدَه. pl. فَحَتَه perversæ,
contrariae res ; subst. conver-
sio, eversio, ruina.

فَحَنَه et فَحَنَه, diversus,
contrarius, perversus' ; pl.
فَحَنَه perversi, f. فَحَنَه
res perversæ.

فَحَدَه vel فَحَدَه e contra.

فَحَنَه inversio, objectio.

فَحَنَه, فَعْلَه, contrarius, rebel-
lis ; deceptor.

فَحَنَه aversus, perversus.

فَحَنَه perversus, mobilis,
فَحَنَه conversio, revolu-
tio ; commotio viscerum ;
conversatio, vitae ratio, mo-
res ; ap. gramm. flexio verbi.

فَحَنَه responsum. فَحَنَه
، سَعْدَه controversia.

فَحَنَه et فَحَنَه avertens.

فَحَنَه aversio, eversio.

فَحَنَه هـ cum conversione ;
cum aversione, retrogressus.

فَحَنَه هـ ; aversio ; mutatio ;
perversitas.

فَكَلَه vel فَكَلَه حَلَّهـ,
simpliciter, frustra.

فَهَه, fut. ; فَهَه vana locutus
est, murmuravit.

Aph. فَهَه id. ; delirare fecit.

فَهَه insulsa loquacitas.

فَهَه vaniloquus.

جَاتِبٌ jactabundus.

مَنْظُورٌ ئَنْظَرُوس, praefectus.

مَنْظُورٌ prae*f*ectura, pl. مَنْظُورٌ.

مَنْظُورٌ id.

مَعْصُومٌ ئَنْعَصُومُوسْتَرْي, centesima, genus usuræ.

مَوْخَدٌ tumultus.

مَفْوِسٌ, fut. مَفْوِسٌ meditatus est, studuit; sollicite quæsivit; trop. occupavit animum.

Ethpe. مَفْوِسٌ meditatus est.

Aph. مَفْوِسٌ occupavit, ad studium compulit.

مَفْوِسٌ meditatio, studium, consideratio.

مَفْوِسٌ, ئَرْوَادِيُوس ardea avis (*gall.* héron).

مَفْوِسٌ imper. verbi مَفْوِسٌ.

مَهْرَقٌ et مَهْرَقٌ, أَهْرَقْتِيكُوس hæreticus, pl. مَهْرَقٌ.

مَهْرَقٌ hæresis.

مَهْرَقْتَلٌ hæreticus factus est.

مَهْرَقٌ ex مَهْرَقٌ et مَهْرَقٌ, hic, مَهْرَقٌ hue. مَهْرَقٌ مَهْرَقٌ exinde. مَهْرَقٌ hic.

مَهْرَقٌ quod hic jacet, quod in terris est.

مَهْرَقٌ, مَهْرَقٌ ئَرْوَامُوك, aroma, pl. مَهْرَقٌ.

مَهْرَقٌ, f. مَهْرَقْتَلٌ pl. مَهْرَقْتَلٌ aromaticus, aromatibus unctus, aromata ferens.

مَهْرَقْتَلٌ et مَهْرَقْتَلٌ id.

مَهْرَقْتَلٌ qualitas aromaticæ.

مَهْرَقْتَلٌ equuleus; jugum teeti.

مَهْرَقْتَلٌ et مَهْرَقْتَلٌ mercurius planeta.

مَهْرَقٌ et مَهْرَقٌ pl. مَهْرَقٌ hylax, thos, (*gall.* chacal).

مَهْرَقٌ أَهْرَقْتِيز, hæresis, opinio.

مَهْرَقٌ hæreticus, hæresiarcha.

مَهْرَقٌ et مَهْرَقٌ هَرَاقْلِيُوس لَيْثُوس, magnes lapis.

مَهْرَقٌ, fut. مَهْرَقٌ altercatus est, certavit, alicui restitut.

Aph. مَهْرَقٌ nocuit, læsit; it. documentum passus est.

Palp. مَهْرَقٌ id. ac مَهْرَقٌ.

مَهْرَقٌ reflexio aeris aquæ speciem referens (*gall.* mirage).

مَهْرَقٌ canis latratus, ululatus.

مَهْرَقٌ litigans.

مَهْرَقٌ litigatio.

مَهْرَقٌ litigatio, certamen, pl. مَهْرَقٌ.

مَهْرَقٌ, مَهْرَقٌ litigans, litigiosus.

ἐκεῖνος, *ex* ἐόν *et* ἀλλότι, illuc.
ἕως ἀλλάτιον adhuc.
μέρι, μέρος, *contr.* *ex* ἐόν *et* ἡμέρα,
hac hora, nunc. ἕως ἀλλάτιον
et μέρος ἕως hactenus.
μέρος *vel* ἡμέρα tempus
præsens.

ἄλλον *id. q.* سُمْلَا .
σόλον larus avis (*gall. mouette*).
ἀλλότιον ἐθικός, ethicus, ad
ethicam pertinens.
ἀέριον, ἀέρον αἰθήρ, æther; *cfr.*
ἀέριον .
ἀέρηον aethereus.

o sexta littera alphabeti Syrorum; numerice. valet: o vel ۶ = 6, ō sextus etc., vide priores literas; o æquivalet hebr. ו et ar. و, nnq. و et و e converso: وعده زنده وعده زنده; respondet tum vocali longæ arabicæ: حَدَّهُمْ vel حَدَّهُمْ tum vocali brevi: بُونِمْ , tum vocali commutatur cum حَوْفْتْ ; in fine sape tacet: مَهْمِهْ .

Est conjunctio:

1º copulativa: et, atque; et cum intens. et quidem, etiam; صَفْهُمْ etiam Petrus. كَهْ

o نَلْ حَكْمَهْ non solum... sed etiam. مُهْ نَلْ nullo modo; cfr. alia s. أَنْ .

2º disjunctiva; tum... tum; nnq. vel, ve. نَلْ nec.

3º adversativa: sed, tamen. نَلْ et tu: tu vero; نَلْ et si non, si non minus, aliquin.

4º comparativa: sicut, velut:

أَمْدَنْا لَهْافْ ؛ ut.... sic etiam.

5º causativa; nam, enim, quia; فَبِهَذَهْ مُهْمَدْ etenim quando advenit dies.

6º finalis; ut, ita ut. نَلْهَمْ حَدَّهُمْ حَدَّهُمْ fames tanta fuit, ut ausi sint homines ingredi.

7º temporalis: dum, quando; tum. حَمَّهْ حَمَّهْ dum dixit, dicens id. q. فَبِهَذَهْ حَمَّهْ .. حَمَّهْ حَمَّهْ cum ingressus est... tum sibi proposuit.

8º concludens: itaque, igitur. حَمَّهْ حَمَّهْ ... نَلْ حَمَّهْ حَمَّهْ ; et dixit ei : ergo pro stulto me habes.

9º tandem o nnq. otiosum est. نَلْ vel حَلَّهْ f. velum, cortina, velum, operimentum; pl. نَلَّهْ مَتَّهْ .

أَنْهَهْ ova piscium.

أَنْهَهْ cavædium, vestibulum.

أَنْهَهْ , ex ar. وَهْ , instinctus, vis imaginativa.

أَنْهَهْ gr. ὄξα et οὐρά, nux avellana (gall. noisette); it. dolor.

لُو, et **لِو**, anser, pl. **لِيْلَو**, f.
لِيْلَو; cfr. ar. **لَوْلَوْ**.

↳ *avis graculo similis.*

μιό et **μιό**, it. **μιό** et **μιοί** loculus; pelvis; fons sacer baptisterii.

باش، ex ar. وَزِير، vizirus, praefectus.

Lo—ro viziratus, officium
præfecti.

Hó perdicis species.

مَوْ, مَوْ interj. vœ, heu ; subst.
 pl. مَلُومَةً malum, miseria,
 مَوْ نَهْ مِنْ de eo multum
 vœ dixit. مَكْوَهْ heu mihi !
 مَوْ نَهْ مَوْ vœ illi !

Nō id. q. Nō.

مُو verb. defect. usit. tant. in
part. præs. مُو, مَكْهُومٌ, emph.
مَكْهُومٌ; pl. مُو, f. مَهْمُومٌ,
emph. مَهْمُومٌ decens, neces-
sarium; impers. in sing.
oportet, decet. مُو debemus;
مَهْمُومٌ وَمَهْمُومٌ hoc facere
coactus sum; - subst. in st.
emph. quod necessarium,
conveniens est, quod debetur,
inde decus, honestas, suprema
officia reddenda mortuis, seu
exsequiæ; dona offerenda ec-
clesiis vel episcopis, etc.; -

adverb. **اَنْهَمْ**, sicut oportet, convenienter, juste.

دَعْمٌ وَّ دَعْمٌ et دَعْمٌ وَّ دَعْمٌ ut oportet,
convenienter.

لِمَّا convenientia.

جَنْتَةُ, *pl.* **جَنْتَاتُ** conveniens, justum; - *in pl. subst.* officia.

Læ*m*ò convenientia, necessi-
tas.

أَلْعَلَّةُ ululatus, ar. وَلَوْلَةٌ .

Foot soccus e lana textus.

لَهْوٌ servus, mancipium; *it.*

~~La~~ servitus, mancipii
conditio.

جَهَنَّمْ conventum omne, in-
de tempus constitutum; locus
ad quem convenitur; signum
constitum, *inde* limes, finis,
pars; res constituta, pac-
tum; cfr. heb. יְמִינָה, et ar. وَعْدَةٌ
promisit. حَدَّهُ locus quo
convenitur (*gall.* rendez-vous)
- adverb. c. *pref.* ↗ vel ↘,
ad occursum, *inde* prope, ad,
versus, circa.

Pa. \checkmark verb. denom. tempus
constituit ad conveniendum,
convocavit; *inde* congregavit.

Ethpa. Σ *oL̄* tempore consti-

tuto convenit, adfuit ; se adjunxit valedixit, se contulit.

جَبَّا , st. c. لَجَّا , c. suff. pers.
جَبَّا . vel جَبَّابُ , a verbo. جَبَّا ,
وَرْدٌ , o radic. excidente et in
vocalem longam commutato,
congregatio ; Ecclesia, temp-
lum, pl. جَبَّاتٍ .

جَبَّاتٌ dimin. ecclesia parva.
جَبَّاتٌ ecclesiastice.
جَبَّاتٌ ecclesiasticus.
جَبَّاتٌ jus ecclesiasticum ;
scientia rerum Ecclesiae.
جَبَّاتٌ festum.

جَبَّاتٌ congregatio ; con-
junctio, seq. جَنَّاتٌ synodus.

جَرَّةٌ genus iridis.

جَفَّ ، vox ar. زَفَّ ، legatum
pium.

جَنْجِيْهٌ , vox ar. وَزَدْ ، rosa.
جَنْجِيْهٌ et جَنْجِيْهٌ anemona.
جَنْجِيْهٌ chrysanthemum
coronarium.

Ethpa. جَنْجِيْهٌ verb. denom.
rosas produxit.

جَنْجِيْهٌ - جَنْجِيْهٌ vena arteria . -
vermis terræ ; nervus ; trop.
venæ, terræ, arborum.

جَنْجِيْهٌ ، مَلْجِيْهٌ genus lacertæ, ar.
ورَنْ .

جَنْجِيْهٌ merops (gall. mésange.)
لَجَّيْهٌ aper sylvestris.

جَنْجِيْهٌ et جَنْجِيْهٌ pullus gallina-
ceus recens exclusus.

جَنْجِيْهٌ et جَنْجِيْهٌ ، vox ar.
folium papyraceum, pl. جَنْجِيْهٌ .
جَنْجِيْهٌ crocus.

جَنْجِيْهٌ ، ar. وَرَشَان ، columba syl-
vestris.

septima littera alphabeti Sy-
rorum, *respondet heb.* ة et ar.
ج . nnq. per أَحْدَوْا : ص par-
vus ; nnq. per ذ et س redditur:
vel per ح , د et دَكْمَهْ justus;
fulsit, اَكْفَهْ ; ذلْ , اَكْفَهْ ;
cfr. permuat. اَكْفَهْ , مَكْفَهْ ,
شَرَطْ , تَرَطْ luna, hier.
أَحْدَوْا ; - numerice valet , vel ح = 7 , ح = septimus, etc ;
cfr. priores litteras.

أَكْلَهْ scabies.

أَكْلَهْ v. s. أَكْلَهْ .

أَكْلَهْ vel أَلِي f. ئَخْلَنْ , aestus
maris.

أَكْلَهْ , v. s. ٥١ .

أَكْلَهْ , لَرِقْ lorica, pl. أَكْلَهْ et
أَكْلَهْ .

أَكْلَهْ , fut. نَسَّهْ وْ نَسَّهْ donavit,
dotavit mulierem.

أَكْلَهْ et أَكْلَهْ dos mulieris,
donum nuptiale.

أَكْلَهْ dimin. praeced.

أَكْلَهْ tremor lactis ; cfr.
ar. زَبْد .

أَحْلَهْ [†] **أَحْلَهْ** [†] **أَحْلَهْ** [†] **أَحْلَهْ** [†] **أَحْلَهْ** [†]

fimus, stercus. **أَحْلَهْ** [†]
fimetum, sterquilinium, lat-
rina.

Pa. **أَكْلَهْ** [†] *v. denom.* stercoravit
agrumentum, fimo saturavit.

Ethpa. **أَكْلَهْ** [†] *pass.* stercoratus
est.

أَكْلَهْ [†] stercorator.

أَحْلَهْ [†] stercoratio.

أَحْلَهْ [†] *et* **أَحْلَهْ** [†] corbis palmarum
foliis vel storeis contexta,
sporta ; cfr. ar. زَبِيل , pers.
زنبل *et* زنبيل .

أَكْلَهْ [†] , fut. نَسَّهْ emit ; rede-
mit ; c. ح pretii. Part. pass
أَكْلَهْ فَحْصَا emptus. أَكْلَهْ , أَكْلَهْ
servus ; f. أَكْلَهْ ; -it. subst. res
empta.

Ethpe. **أَكْلَهْ** [†] *pass.*

Pa. **أَكْلَهْ** vendidit, captivum re-
dimi curavit.

Ethpa. **أَكْلَهْ** [†] *pass.*

أَكْلَهْ [†] *et* **أَكْلَهْ** [†] emptiso ; re
empta, merces.

أَكْلَهْ [†] emptio, pretium rei.
أَكْلَهْ [†] obsonator.

compescuit; prohibuit a, cohibuit, increpavit *cum* حـمـ ;
cfr. ar. زـجـ .

Ethpe. أـبـحـنـ pass.

Pa. حـنـ cohibuit.

Aph. حـنـ increpavit; seq. حـمـ prohibuit a, amovit.

حـنـ cohibitio.

حـنـ ar. زـجـ , piscis magnus.

حـنـ repagulum januæ.

حـنـ jugulum.

حـمـ , heb. حـمـ , ar. صـقـ justus, conveniens fuit; in *Peal usitat.* in part. tantum. حـمـ ,
part. pres.; - adj. justus, æquus, conveniens fuit.;
nnq. ut. حـمـ ; plerumque im-
pers. justum, æquum est, de-
cet, oportet. - subst. affinis,
propinquus.

Pa. حـمـ justificavit, justum agnovit *vel* declaravit, *inde* approbavit, adjudicavit: ele-
mosynas dedit, debitum remisit.

Ethpe. حـبـ pass.

حـمـ id quod justum est, id quod debetur, *inde* jus, regula, præceptum; officium, vectigal, salarium, justa poena; eleemosyna. حـمـ illegalis. حـمـ ego

debitor tuus sum. حـمـ recto modo, justa ratione.

حـمـ , pl. حـمـ eleemo-
syna; cfr. ar. حـدـقـةـ .

حـمـ juste, ut decet.

حـمـ justus, æquus.
حـمـ convenientia.

حـمـ justitia, justificatio;
dijudicatio, decretum; ele-
mosyna, legatum, donum.
حـمـ justus, innocens,
integer, probus.

حـمـ justitia; elec-
mosyna.

حـمـ juste, integre.

حـمـ , pl. حـمـ ; it. حـمـ Sadduæus.

حـمـ secta Sadduæorum.

حـمـ et حـمـ justificatio.
حـمـ justicator.

حـمـ vel حـمـ , fut. حـمـ gloriatus
est. Part. pres. حـمـ , glorians;
it. fœtidus. Part. pret. حـمـ ,
حـمـ , nitidus, splendens; præ-
clarus, gloriosus, pius, cau-
tus; subst. in emph. حـمـ
vestis splendida.

Ethpe. حـمـ splenduit; glori-
fieatus est.

Pa. حـمـ purificavit, splen-
dem reddidit; gloriﬁeavit.

Ethpe. حـمـ pass.; it. splenduit.

مَهْمَنْتِي pure, splendide ; - accurate, diligenter.

لَهْمَنْتِي splendor, puritas; excellentia, honor; superbia.

مَهْمَنْدِي illustrator.

٤٥١ — *Pa.* مَهْمَنْتِي immundum, foetidum fecit.

Ethpa. مَهْمَنْجِلِي fœtuit.

مَهْمَنْتِي immundus, foetidus.

مَهْمَنْتِي, مَهْمَنْتِي fœtens.

لَهْمَنْتِي et لَهْمَنْتِي fœtor, corruptio.

٤٥١, fut. مَهْمَنْجَلَى luxit, fulsit, splenduit, ar. زَهْرَ - it. vigilans fuit, plerumque in part. pass.; cfr. ar. سَهَرَ vigilavit. مَهْمَنْجِلِي, vigilans; c. مَهْمَنْجِلِي cavens; - adj. tutus; prudens, rectus.

Ethpe. مَهْمَنْجِلِي invigilavit; c. مَهْمَنْجِلِي cavit, attendit.

Pa. مَهْمَنْجَلَى monuit, præcepit, invigilare jussit; tutum, cautum reddidit; it. ut *Ethpe*.

Ethpa. مَهْمَنْجِلِي id. q. *Ethpe*.

Aph. مَهْمَنْجَلَى splenduit, coruscavit; accedit.

لَهْمَنْجِلِي fulgor, splendor; flos, venenum; cfr. زَهْرَ ar. flos, et pers. venenum.

لَهْمَنْجَلَى, f. مَهْمَنْجَلِي admonens.

مَهْمَنْجَلَى caute, circumspecte, diligenter.

مَهْمَنْجَلِي, لَهْمَنْجَلِي præmonitio, vigilantia, cautio, inde securitas, incolumentis.

لَهْمَنْجَلَى admonitio, providentia; monitum, cautio.

مَهْمَنْجَلِي monitorius.

مَهْمَنْجَلِي monitorie.

لَهْمَنْجَلِي nitor, splendor.

مَهْمَنْجَلِي, مَهْمَنْجَلِي fulgor, splendor, radius lucis.

لَهْمَنْجَلِي splendor.

لَهْمَنْجَلَى, fut. لَهْمَنْجَلَى tumuit; trop. superbia inflatus est; cfr. لَهْمَنْجَلَى. Part. præs لَهْمَنْجَلَى, لَهْمَنْجَلِي. Part. præt. لَهْمَنْجَلَى, لَهْمَنْجَلِي.

Ethpe. مَهْمَنْجِلِي inflatus est.

Ethpa. مَهْمَنْجِلِي id. q. *Pe*.

Aph. مَهْمَنْجَلَى tumere fecit; it. recalusit in angulo; cfr. ar. زَهْرَى.

لَهْمَنْجَلَى jactabundus; it. angulosus, a voce لَهْمَنْجَلَى.

لَهْمَنْجَلَى intumescentia.

مَهْمَنْجَلِي gloriatio.

لَهْمَنْجَلَى, pl. لَهْمَنْجَلَى angulus, ar. زَارِيَةً — it. dux.

Palp. مَهْمَنْجَلَى id. q. *Pe*.

Ethpalp. لَهْمَنْجِلِي intumuit, gloriatus est.

لَهْمَنْجَلَى et لَهْمَنْجَلَى gloriatio.

مَهْمَنْجَلِي superbus, jactator.

لَوْي, cfr. ζυγόν vel ζεῦγος
et ar. زَوْج, pl. لَوْيَوْن, لَوْيَة
jugum, currus; par. لَوْيَة
بِمُهْفَتْنَةٍ par turturum;
adj. compar, geminus; ap.
gram. conjugatio; in pl.
abs. bilanx. لَوْيَةٌ لَوْيَةٌ
bini; لَوْيَةٌ صَدِيقٌ, pl. لَوْيَةٌ صَدِيقٌ
socius, collega, aequalis, ma-
ritus; currus, لَوْيَةٌ لَّهٰن pl.
لَوْيَةٌ حَتَّى socia, uxor.
Pa. لَوْيَةٌ verb. denom. univit;
matrimonio junxit. Part.
pass. لَوْيَةٌ, f. مَهْرَبَةٌ, ma-
ritatus.
Ethpa. لَوْيَلٌ pass.; — it.
coivit.
Aph. لَوْيَلٌ univit, junxit.
Ettaph. لَوْيَلٌ pass.
لَوْيَلٌ par, duplex; me-
tricus.
لَوْيَةٌ, لَوْيَةٌ conjunctio, con-
jugium; coitus.
لَوْيَةٌ نُبْلِيْسٌ nubilis.
لَوْيَةٌ مَعْجَنْتِيْسٌ conjunctim.
لَوْيَةٌ مَعْجَنْتِيْسٌ id. q. لَوْيَةٌ .
لَوْيَةٌ مَعْجَنْتِيْسٌ et لَوْيَةٌ مَعْجَنْتِيْسٌ matri-
monium.
لَوْيَةٌ مَعْجَنْتِيْسٌ metrum Ephre-
micum constans quatuordecim
syllabis in duplex hemisti-
chium divisus, ar. المُزْدَوْجَةُ .

لَوْيَةٌ - cfr. ar. لَوْيَةٌ viaticum
comparavit.
Pa. لَوْيَةٌ viatico, commeatu ins-
truxit; dotavit.
Ethpa. لَوْيَلٌ pass. et refl.
لَوْيَةٌ, pl. لَوْيَةٌ viaticum.
لَوْيَةٌ id.
لَوْيَةٌ, ar. مَزْوَدٌ, pera viato-
ria.
لَوْيَةٌ مَعْمَلٌ ζωδιακός Zodiacus seu
orbis signifer.
لَوْيَةٌ مَعْمَلٌ ζῳδίον, pl. لَوْيَةٌ signum
cœleste in Zodiaco. id q. ar.
لَوْيَةٌ .
لَوْيَةٌ مَعْمَلٌ, pl. لَوْيَةٌ مَعْمَلٌ fenestræ,
pinnae muri, turres, specula.
لَوْيَةٌ, لَوْيَةٌ, pl. لَوْيَةٌ et لَوْيَةٌ, babyl.
zuzu, drachma moneta et pon-
dus; mensura liquidorum;
it. squilla, planta bulbosa,
ar. لَوْيَةٌ .
لَوْيَةٌ, vide لَوْيَةٌ .
لَوْيَةٌ زَيْزِيْفُونٌ, zizyphus; pru-
num.
لَوْيَةٌ, fut. لَوْيَةٌ, cfr. لَوْيَةٌ et
لَوْيَةٌ زَارَهُ, motus est, elatus est,
abiit, discessit, migravit;
لَوْيَةٌ وَنَحْهَهَتْ se paravit ad seri-
bendum. Part. act. لَوْيَةٌ .
Part. pass. لَوْيَةٌ .

Pa. مَسْ movit, gestavit, circumtulit cum pompa. مَسْ حَمْدَةً mortuum ad sepulchrum deduxit ; - *trop.* celebravit, honore extulit.

Ethpa. اَوْسِلْ pass.

Palp. سَسِ movit.

لَوْيَ elatio, processio seu circuitus solemnis, pompa; *Transfiguratio Domini*; *trop.* fastus, arrogantia.

سَهْنَأْ, اَهْنَأْ id.; funus.

مَسْتَنْ سatelles.

مَوْسِنْدَهً egressus cum pompa; pompa, processio.

لَهُوْي et لَهُوْي puerulus.

خَوْي - خَوْي id. q. خَوْي v. s. خَوْي .

لَهُوْي rostrum, proboscis; it. زَوْبِرْ, jusculum; avis aquatica.

خَوْي vel مَهْوَي f. زَعْمَنْ, fermentum.

لَهُوْي , fut. لَهُوْي cibavit, sustentavit; impertivit.

Ethpe. اَلَّا لَّا pass.

Aph. اَلَّا pavit.

امْدَهْ cibatio, impertitio, donum.

لَهُوْي sustentator, providens.

لَهُوْي sustentatio.

مَهْوَي , مَهْوَي victus, cibus.

لَهُوْي , لَهُوْي , لَهُوْي f. , زَوْنَه , pl. لَهُوْي , لَهُوْي , zona, cingulum; zona cæli.

لَهُوْي , زَوْنَهْ , cingulum, superhumeral.

لَهُوْي , fut. لَهُوْي , cfr. heb. حَوْل et ar. زَاءَ vel زَاءَ motus est, se movit; tremuit, commotus est; *impers.* اَهْهَ conturbatus sum. Part. act. اَهْلِي , f. اَهْلِهَ tremens. Part. pass. اَهْمَأْ , اَهْمَأْ , f. emph. اَهْمَهْ commotus, conturbatus; -adj. horrendus, terribilis, demens.

Ethpe. اَلَّا لَّا id. q. *Pe.*

Aph. اَهْلِي commovit, turbavit; removit; *apud* gramm. movit vocali litteram. Part. act. اَهْمَهْ emph. اَهْمَهْ ; adj. vanus, vilis; vile quid. Part. pass. اَهْلِهَ , اَهْلِهَ , f. emph. اَهْلِهَ .

Palp. اَهْدَى , cfr. زَعَزَعَ, vehementer agitavit, perturbavit.

Ethpalp. اَهْدَى لَهُوْي pass. præc. — it. *trop.* labefactatus est.

لَهُوْي , لَهُوْي , pl. لَهُوْي , motus, tremor, terræmotus; *trop.* tumultus, seditio, casus, ruina; *apud.* gramm. motio litteræ; *in plur.* facultas.

tates mentales; passiones; -
adject. c. præf., , terribilis.
خَوْفٌ ad vocalem spectans.
خَوْفٌ , st. c. خَوْفٌ , commotio,
tremor.

امْحَاطٌ et **امْحَاطِي** pavidus.
امْحَاطٌ et **امْحَاطِي** motus, con-
 turbatio.
امْحَاطٌ et **امْحَاطِي** motus,
 mobilis.

مَدْنَدِنَةٌ *trepide.*
مَدْنَسَهَا *res insulsa, ineptiae.*
مَدْنَخْنَى *motor.*
مَدْنَحْنَى *concussor.*
مَدْنَاهَهَا *mobilitas, commo-
tio; ap. gramm. vocalis addi-
tio.*

לְפָנֵי, cfr. בַּנָּא, בְּסִרְבָּרֶז, hys-
sopus et رُوقَى aspersorium ;
וְסֻרְבָּרֶז sordes lanæ.

၆၀၁ - Pa. କୁର୍ଦ୍ଦ ଅଦୁଲତାରେଖି,
corrupit, mendacii arguit.

Ethpa. **كَوْمَةٌ** pass.; dolose
egit.

أَدْفَأْ، *nng.* أَمْحَى et أَمْحَا adulteratio, falsitas, fraus. كَنْ أَنْمَى، *nng.* homo dolosus.

Ethpalan اَثْوَلَن् verb. denom.
mendax, vafer fuit, dissimulavit, decepit.

فَرْعَانٌ fraudulenter.
فَرْعَانٌ fraus.
فَرْعَانٌ, **فَرْعَانٌ** adulteratus; *trop.*
 vitiosus.
فَرْعَانٌ corruptor.

۵۰۱, fut. **۵۰۲** ardenter
cupivit; efr. ar. شوق deside-
rium. Part. præs. **۵۰۳**, **۵۰۴**,
pl. **۵۰۵**.
عَصَمٌ et عَصْمَانٌ, vide s. أَعْصَمٌ.
عَصْمَانٌ grando, tenuis pruina;
عَصْمَةٌ id.

וְזַהֲרֵל, fut. **זָהָרֵל**, heb. זָהָרֵל, pu-
gnis impetivit, pugillo cepit;
strinxit. Part. act. **זָהָרֵל**, pl.

Aph.  deflexit, discessit.
ἴσοι *m.*, *pl.* *ἴσοι* et *ἴσοι* pugnus,
pugillus; vola manus; trop-
potestas.

πέκτος, *pectus, ar.* زَفْرَزْ .
κερβός, *cervisia.*

locusta; cfr. heb. לְבָתָר repdit
statura pusillus, f. أَسْمَكَهُ
pl. أَسْمَكَهُمْ brevitas, humilitas
angustia oculorum.

ام, fut. **ئىمەت** trusit,
repulit, ineitavit.

اسْعَى	repulsio, impetus.
أَسْهَدَ	repellens, trudens.
أَسْهَدَ	<i>id.</i> ; tactui resistens.
أَسْهَدَ	resistentia tactus.
أَسْهَدَ	incitatio.

፳፭፻ *v. denomin.* vituperavit,
accusavit ; reiecit.

Ethpa. ~~αἴσθι~~ pass. - *it.* abhor-
ruit.

لَمْ يَفْعُلْ part. pass. - adj. culpabilis.

لِسْمَنْدَر culpator.

Hibisci parvulus.

أَحْمَدُ vagina ensis, theca.

lux, splendor, ornamentum; lampas; *it.* accipiter.

أَمْنَدٌ et أَمْنَدًا *zizania*; pl. أَمْنَدٌ; cfr. ζιζάνιον et ar. زَوَان.

أَمْتَ *pl.* **أَمْتَ** armatura, arma ;
apparatus bellicus, ornatus,
ar. **أَمْتَ**.

Pa. $\check{\text{c}}\text{í}$ *v. denom.* armavit, robavit.

Ethpa. **اَوْلَى** pass. et reflex.
اَحْمَدُوا armatura.

أَمْحَارُ, *assyr.* ziku, ingens pluvia, turbo; *bolis*; *trop.* fulgor. أَمْحَارُ *fulmen*.

امْتَحِنُ *v. denom.* turbine dis-
persit; agitavit.

بِهِ **ventilatio.**

لُنْوَلَهُ، لُنْوَلَهُ lunula ; torques.

أَمْدَنْ m., pl. أَمْدَنْ et أَمْدَنْ oliva arbor et fructus, oleum; it. et usitatiss. أَمْدَنْ ح olive-tum. أَمْدَنْ, أَمْدَنْ oleaster.

بِرْدَةٌ et بِرْدَاتٌ dimin. olea
parva; in pl. بِرْدَاتٌ وَأَوْحَادٌ
radices cyperi.

اَحْمَلُ, fut. **فَتَدُ** *vicit, superavit; purus fuit, innocens inventus est; justificatus est;* cfr. **اهْمَلَ** et **اهْمَلَ**. Part. act. et præs. **اهْمَلُ**, **اهْمَلَ** *vincens; justi-*

- ficatus. *Part. pass.* أَفْتَ , اَفْتَ victus.
- Ethpe.* اَوْدَتْ victus est.
- Pa.* أَفْتَ victorem reddidit; justificavit, absolvit; innocentem declaravit. *Part. act.* اَمْفَتْ justificans. *Part. pass.* اَمْفَتْ victor factus, dominans.
- Ethpa.* اِلْوَفَتْ justificatus est; insons declaratus est.
- أَفْتَ , اَفْتَ victoria, præmium victoriæ; justificatio, innocentia.
- أَفْتَ اَنْتَ innocens.
- أَفْتَ , اَفْتَ et اَفْتَ victor; innocens, purus, justificatus.
- أَفْتَ innocentia.
- مُدْوَفَتْ , مُدْوَفَتْ vincibilis.
- مُدْفَتْ justificator; victorem reddens.
- مُدْفَتْ vincibilitas, strages.
- أَفْتَ , fut. بَدْهَةً , cfr. assyr. zakaru, daemонem aut mortuum evocavit, incantavit.
- Pa.* بَدْهَةً magiam exercuit.
- أَفْتَ et بَدْهَةً hariolus, incantator; mortuus evocatus.
- أَفْتَ incantatio, hariolatio.
- أَكْتَ v. denom. agitavit, aestum movit.
- اَكْجَنْتَ anguilla.
- اَكْهَدْنَا vel اَكْهَدْنَا cervus.
- اَكْحَنْتَ membrum virile.
- اَحْجَنْتَ et اَحْجَنْتَ dulciaria; cfr. ar. زَيْنَةً .
- اَكْحَنْتَ anguilla; sporta.
- اَلْجَنْتَ , pl. اَجْنَنْتَ lux, radius, flamma; fulgor, splendor; metaph. elucidatio; cfr. اَكْعَنْتَ et اَكْعَنْتَ .
- Pe.* اَلْجَنْتَ , et usitat. *Aph.* اَلْجَنْتَ v. denom. luxit, splenduit.
- Part. act.* اَلْجَنْتَ splendens.
- Ettaph.* اَلْجَنْتَ illuminatus est.
- أَكْمَنْتَ lucem emittens, irradians.
- اَكْنَتْ lampas.
- مُكْنَنْتَ splendor.
- اَلْجَنْتَ abbreviavit, imminuit; cfr. اَلْجَنْتَ et neo-syr. اَلْجَنْتَ turbavit.
- مُذْكَنْتَ , مُذْكَنْتَ p. pass.-adj. brevis, rarus; inops, angustus, vilis.
- Ethpalp.* اَلْجَنْتَ abbreviatus est, perturbatus est; defecit, inops factus est.
- مُذْكَنْتَ p. pass. consumptus, abbreviatus; inops, sterilis, destitutus.

ἰόποί, ιόποι inopia, defectus,
angustiæ.

دُلْجَنْدَى **raro.**

لِهِيَّا مَدْحُودٌ brevitas, raritas,
inopia.

سَلَّمَ, fut. **سَلَّمَ** con-
spersit, sparsit, effudit; c.
fut. **سَلَّمَ** con-
spersit, sparsit, effudit.

Ethne ~~and~~ mass.

conspersio, effusio,

լուս, *p. pass.* effusus; - *subst.* lamina.

~~ل~~ ^ل, fut. ~~ل~~ و ~~ل~~ et ~~ل~~ ل eve
fuit *pondus*, defecit, *inde* vi-
luit, *despectui* fuit; cfr. ar.
~~ل~~.

Pa. vilem reddidit, inquinavit: convitiatus est.

*Ethpa. Ἀλλά, οὐ vilis factus est,
contemptibilem se fecit; it.
luxuriatus est; se agita-
vit; se jactavit.*

Aph. **¶** il sprevit; ad malum
illexit; vilem reddidit.

~~ū~~ ~~s~~o^f vilitas, opprobrium;
luxus.

விலி, விலி vili, contemptus ; luxurians ; libidinosus.

لِبِيْدِنُوْس libidinose; contemptim.

أَبْجَدْنَا abjectio; illecebra, lascivia.

لُوكْسُرِيَّةٌ luxuria, libido.

ፋኑ, fut. እዱ detorsit, de-
flexit; pervertit; ap. gramm.
vocali (ፉ) instruxit.

Ethpe ~~καὶ~~, ^{τι} *pass.* et *refl.*

Aph. **أَخْمَدٌ** id. ac Pe.

كُحْمًا, *et كُحْمًا* obliquitas; *trop.*
pravitas, culpa; *ap. gramm.*
vocalis (τ).

اَكْعُدَا part. pass.; it. adj. obli-
quus, tortuosus; trop. pra-
vus; ap. gramm. vocali (↑)
insignitus.

كُمْبَمْ oblique, tortuous.

هَمْكَهْمَةٌ, **هَمْكَهْمَةٌ**, obliquitas, tortuositas; flexio.

هَلْكَمَ, fut. **هَلْكَمَهُ** hausit,
exhaustit; effudit ut **هَلْكَسَ**.

Ethpe. *ঝঃ!* pass.; trop. turbatus est, vacillavit.

أَكْنُسٌ, haustus; - subst. ut
أَكْنَمٌ.

جَنْدِي hauriens, *inde* cyathus,
patera.

لَعْنَدْنَجْ actus hauriendi.

عَلَى, fut. **عَلِيٌّ**, cfr. ذَلِكَ,
stillavit; stillare fecit, ex-
hausit.

كُفَّا stillatio, effusio; fluxus menstruus; *it. ut seq.*

أَدْفَدَا et أَدْفَدَا, *pl.* أَدْفَدَا

concha margaritifera, ostrea; pondus, mensura.

أَكْفَرْ ornatus, vestium nitor.

مَكْفُرْ politus, ornatus; coloratus.

مَكْفَافِهَةَ ornate, eleganter.

أَدْفَهَةَ وَأَدْفَهَهَا volumen, liber.

أَكْلَمْ — *Aph.* أَكْلَمْ illumini-

navit, lumine perstrinxit, splendere fecit.

Ettaph. أَكْلَمْ لَامْ pass.

أَكْلَمْ lux, splendor, radius; *cfr.* أَكْلَمْ.

أَكْلَمْ مَدْرَمْ radianti modo, more radii.

أَهْدَى — *Pa.* أَهْدَى *et Aph.* أَهْدَى

nocuit, damno affecit; *cfr.* أَهْدَى ζημία, injuria.

Ethpa. أَهْدَى لَوْمَهْ pass.

مَهْمَهْهَهَا injuria.

أَهْمَهْهَهَا thymum; *cfr.* *supra* أَهْمَهْهَا.

أَهْدَى, pers. زَهْرَان, venenum.

أَهْمَهْهَهَا et أَهْمَهْهَهَا oscillum.

أَهْمَهْهَهَا σφιλη, scalprum, culter.

أَهْمَهْهَهَا pruina, glacies.

أَهْمَهْهَهَا pruinosis.

أَهْمَهْهَهَا lychnuchus; *cfr.* مَهْمَهْهَهَا.

أَهْرَى, fut. أَهْرَى sonuit, susurravit, tinnivit; ligavit, constrictxit.

Aph. أَهْرَى resonavit.

Palp. أَهْرَى tinnire fecit; *cfr.* ar. زَعْزَرْ susurravit.

Ethpalp. أَهْرَى لَوْمَهْ tinniens factus est, *inde* diffusus est rumor.

أَهْرَمْهَهَا tinnitus.

أَهْرَمْهَهَا tinnitus, strepitus, surrus; *it.* capistrum; frænum, annulus, *ar.* زَقَارْ.

أَهْرَمْهَهَا et أَهْرَمْهَهَا tinnitus.

أَهْرَمْهَهَا susurrans incantationes, *inde* magus, *ar.* زَمَازِقَةَ magi.

أَهْرَمْهَهَا smegma, unguentum.

أَهْرَمْهَهَا, *pl.* أَهْرَمْهَهَا capillus.

أَهْرَمْهَهَا, *cfr.* أَهْرَى, heb. זְמַן et ar. زَمَنْ, ex quo verb. denom. seq.

Pa. أَهْرَمْهَهَا tempus constituit, *inde* convocavit, invitavit, paravit, adduxit; *c.* أَهْرَمْهَهَا incitavit.

Ethpa. أَهْرَمْهَهَا pass.

أَهْرَمْهَهَا, أَهْرَمْهَهَا invitatus, socius; paratus, destinatus.

أَهْرَمْهَهَا invitatio.

أَهْرَمْهَهَا, f. مَهْمَهْهَهَا praeparans, invitans; causa, auctor.

invitatio facta, actio invitandi.

invitatio recepta.

fut. cecinit, psalmos cantavit.

pass.

id. q. Pe.

cantatus est.

cantus, musica ; psalterium.

ars musicæ.

st. c. L. pl. canticum, psalmus.

psalmodia, cantus.

cantor ; tibieen.

musice.

heb. , psalmus.

cantabilis.

cantator, psaltes.

psalmodia.

ad psalmos pertinens.

tibia.

f. cæsio colore præditus ; cfr. ar. أَسْمَرْ .

cæsius color.

et بَلْ بَلْ , smaragdus.

fut. scortatus est, Part. act. لَبِّي , لَبِّي , f. emph. لَبِّي ; subst, meretrix.

frequenter scortatus est. Part. مَدَّنَا , pl. مَدَّنَاتٍ et مَدَّنَسٌ .

stupratus est. moechator, f. أَنْسَادا meretrix.

fornicatio, adulterium.

scortatorius.

fornicatio, adulterium.

uleus, pustula.

, vide أَحَمَّلا .

strepitus, sonitus ; ornatus.

, ar. زَنْجِيل , zingiber planta.

tintinnabula equitatus, strepitus curruum.

aerugo ; cfr. ar. زَنْجَار .

Pa. بَرْ - بَرْ evacuavit.

manica indusii, manipulus sacerdotis, pl. أَبَنَابا .

terræmotus, cfr. زَلْزَلَة .

Ethpalp. بَلْ بَلْ v. den. tremit, commota est terra.

tumor.

et لَرْ , لَرْ , cfr. pers. et chald.

, pl. اَسْتَسٌ , c. aff. أَسْتَسٌ , أَسْتَسٌ .

modus, species, qualitas ; ratio, methodus ; in pl. mo-

res; — *adv.* حَامِنْ ad modum.
أَمْ وَأَمْ et أَمْ , v. s. .
حَامِنْ *alio modo.*
حَامِنْ بِمُكْتَنْ peculiari modo.
حَلَّا أَتْتَسْ بِqua ratione.
magnopere. لَأَسْ مُ فَ أَتْتَسْ
nullo modo ; مَتَّخَا وَأَتْتَسْ أَتْتَسْ
rees variæ.

أَنْسَنْ varius, multiformis.
أَنْسَنْ varietas.

احص , *fut.* تُنْهَمْ jecit, ejecit,
sagittavit ; alligavit, cons-
trinxit.

Ethpe. اَوْنَهْ jactus est.
أَنْهَا jactus, jaculatio, ejectio :
ligatio.

أَنْهَا et أَنْهَا frænum ; ocrea,
قَرْبَنْ ; it. barba ; cfr. pers.
زَنْجَنْ mentum. حَنْ أَنْهَا ocrea.

أَنْهَدَا , *pl.* أَنْهَدَا aer frigidus.

أَنْهَا rheuma ; it. zona, cingu-
lum, gr. ζωνάριον, dimin. a
ζώνη.

أَنْهَنْةَا coryza laborans.

أَنْهَنْ , *vide* ۸۰۱ .

احم , *fut.* تُنْهَمْ reprehendit, objurgavit, exprobra-
vit.

Pa. اَنْهَنْ increpavit, ruborem
intulit.

احم et اَنْهَنْ reprehensio,
irrisio.

احف , *fut.* تُنْهَمْ incre-
pavit, impulit. *Part. pass.*
أَنْهَفَا - *adj. ut* اَنْهَفَا .

Ethpe. اَوْنَهْ iratus est ; tor-
vis oculis intuitus est, e. ح .
Pa. اَنْهَفَ graviter exprobravit.
احف et اَنْهَنْ increpatio ; indi-
gnatio.

احف et اَنْهَفَا اَنْهَفَا durus, austerus,
iratus.

احف iracunde.

احف dure, iracunde.

احف ut اَنْهَفَا æstus ignis.

احف increpans, irascens.

احف irate.

احم , *fut.* تُنْهَمْ et اَنْهَفَا clamavit, clangorem edidit .

Aph. اَنْهَفَ id.

Ettaph. اَنْهَفَ pass.; vocatus
est.

احف clamor, vociferatio.
clangor.

احف clamans, vociferans.

احف clamor, elatio voicis.

احم , *fut.* تَحْنَ parvus fuit
aut factus est, diminutus est ;
it. trop. pusillanimis fuit ;
cfr. heb. נַעֲזֵב et ar. ضَعْلَى .

Ethpe. اَوْكَنْ constrictus est,
coaretatus est.

Pa. اَكْنَ parvi fecit.

Aph. اَكْنَ minuit, humiliavit,
parvipendit.

اَحْمَدْاً, اَحْمَدْاً parvus, modicus,
exiguus, minor, vilis; ad-
verb. in st. c. paulum, modi-
ce; f. اَحْمَدْاً, emph. اَحْمَدْاً,
pl. m. اَحْمَدْاً, اَحْمَدْاً, pl. f.
اَحْمَدْاً, emph. اَحْمَدْاً, pauca;
subst. res viles. اَحْمَدْاً مُعْدِنْا
modicea fidei. اَحْمَدْاً
paulo post. قَبْ اَحْمَدْاً ad mini-
mum. بِلْ حَدَّهْ اَحْمَدْاً non modice.
اَحْمَدْاً et اَحْمَدْاً paulum,
modice, breviter.
اَحْمَدْاً parvitas, pusillanimitas;
parvus numerus; defectus.
اَحْمَدْاً et اَحْمَدْاً mespilus.

اَفْرَأْ vel اَفْرَأْ pilus, capillus,
pl. اَفْرَأْ.

اَفْكَرْ et اَفْكَرْ a ^ et اَفْكَرْ, cfr.
ar. ذُلَانْ, sic, ita; tot, talis,
hujusmodi; quidam, aliquis.
اَفْكَرْ اَفْكَرْ talia dixit.
اَفْكَرْ اَفْكَرْ et caetera.

اَفْتَنْ fut. اَفْتَنْ fœtuit.

Ethpe. اَوْكَنْ sordidus fuit, male
oluit.

Pa. اَفْتَنْ inquinavit, fœtidum fecit.

اَفْنَ fœtens.

اَفْنَ et اَفْنَ fœtor, odor pra-
vus.

اَفْهَنْ, id. q. اَفْنَ.

اَفْهَنْ fremitus; fœtor.

اَفْنَ, pl. اَفْنَ, et اَفْنَ mystax.

اَفْنَ pix; cfr. اَحْمَدْا, et ar. زفت.

اَفْنَ verb. den. pice illivit.

اَفْنَ pice illitus.

اَمْرَمْدَا annulus januae, etc., pl.
اَمْرَمْدَا, اَمْرَمْدَا.

اَمْرَمْدَا parvulus.

اَمْرَمْدَا et اَمْرَمْدَا, pl. strigilis; cfr. اَمْرَمْدَا.

اَمْرَمْدَا faba.

اَمْرَمْدَا grando levis, id. q. اَمْرَمْدَا,
v. s. اَمْرَمْدَا.

✓

اَمْرَمْدَا, fut. تَرْمَمْدَ erexit, ex-
tulit, suspendit; se erexit,
vocali (۹) insignivit. اَمْرَمْدَ

خَلْ مَصْفَا crucifixit. Part.

pass. اَمْرَمْدَا; adj. elatus, tumi-
dus; - subst. crux; crucifixio.

Ethpe. اَوْكَنْ erectus est, se
erexit; riguit coma; cruci-
fixus est.

Pa. اَمْرَمْدَ arrexit crines.

اَمْرَمْدَ erectio, suspensio;
palum; it. vocalis (۹)

اَمْرَمْدَ crucifigens.

اَمْرَمْدَ erectio, suspensio,

crucifixio ; it. crucis religio.
اُمَّهَدْا clava, pl. اُمَّهَدْا .

اُمَّهَدْا arrectus ; adj. asper,
salebrosus.

اُمَّهَدْا erectio.

اُمَّا uter, pl. اُمَّا ; ar. زَقْ .

اُمَّهَدْا et اُمَّهَدْا diminut. ejusd.

اُمَّهَدْا hydropicus.

اُمَّهَدْا , v. s. ۵۰۱ .

اُمَّهَدْا , fut. تَأْمِهَةٌ texuit ;
trop. composuit.

Ethpe. اُبُوهَةٌ pass.

اُمَّهَدْا actus texendi ; tela.

اُمَّهَدْا textor.

اُمَّهَدْا textum quid, textura,
inde volumen variis tractati-
bus contextum.

اُمَّهَدْا baculus, fustis.

اُمَّهَدْا , f. اُمَّهَدْا textor, pl. اُمَّهَدْا ,
f. اُمَّهَدْا .

اُمَّهَدْا ars textoria.

اُمَّهَدْا instrumentum textoris,
pl. اُمَّهَدْا .

اُمَّهَدْا , fut. تَأْمِهَةٌ pupugit ;
trop. stimulavit, afflixit.

Ethpe. اُبُوهَةٌ pass. et reflex.

Pa. اُمَّهَدْا pupugit, vulneravit.
اُمَّهَدْا stimulus, spasmus, op-
probrium.

اُمَّهَدْا m., pl. اُمَّهَدْا stimulus,

virga ; trop. tremor ; it. te-
tanos, al. اُمَّهَدْا .

اُمَّهَدْا pungens, inde aculeus,
stimulus ; acumen ferreum
aratri ; trop. opprobrium, pl.
اُمَّهَدْا .

اُبُوهَةٌ — Pa. اُبُوهَةٌ equum concedit.

Ethpe. اُبُوهَةٌ equo vectus est.

اُبُوهَةٌ eques, pl. اُبُوهَةٌ .

اُبُوهَةٌ equitans.

اُبُوهَةٌ equitatio.

اُبُوهَةٌ et اُبُوهَةٌ exclam. lamentantis :
vae ! lieu !

اُبُوهَةٌ , fut. تَأْمِهَةٌ pressit,
coaretavit, ursit, repulit ;
اُبُوهَةٌ ۚ ۚ ۚ confertim
adveniebant. Part. pass.
اُبُوهَةٌ , adj. angustus,
rapidus ; it. vocali (^) in-
signitus.

Ethpe. اُبُوهَةٌ pass.

Pa. اُبُوهَةٌ trusit.

Aph. اُبُوهَةٌ cohibuit, repressit.

اُبُوهَةٌ repagulum januæ, claus-
trum, compressio.

اُبُوهَةٌ pressio, compressio, angus-
tiae.

اُبُوهَةٌ pressura, massa. اُبُوهَةٌ
cordis angustiae.

اُبُوهَةٌ pressio, angustiae ; dolor
intestinus, pl. اُبُوهَةٌ .

﴿اَوْهَدَمَا﴾ turbo, tempestas.

﴿اَوْهَدَمَا﴾, pl. ﴿اَوْهَدَمَا﴾ turbo.

﴿اَوْهَدَمَا﴾, ﴿اَوْهَدَمَا﴾ pressio, compressio ; impetus.

﴿اَوْهَدَمَا﴾ blitum *planta* (*gall. blette*).

﴿اَفَ﴾, fut. ﴿اَوْهَدَمَا﴾ splenduit, rutilavit. Part. ﴿اَفَ﴾, ﴿اَنْهَدَمَا﴾ splendens; subst. ﴿اَنْهَدَمَا﴾ aureus *sen* subflavus color; topazius, amethystus; f. ﴿اَنْهَدَمَا﴾ cæsiis oculis prædita.

﴿اَوْهَدَمَا﴾ et ﴿اَوْهَدَمَا﴾ splendor *oculi*. — *Ethpal.* ﴿اَوْهَدَمَا﴾ condensatus est.

﴿اَفَ﴾, fut. ﴿اَنْتَهَدَمَا﴾ constrinxit, strangulavit.

Pa. ﴿اَفَ﴾ miscuit, turbavit.

﴿اَوْهَدَمَا﴾ constrictio ; strangulatio.

﴿اَفَ﴾ affectio, amor intensus.

﴿اَوْهَدَمَا﴾ lorica ; *cfr. pers.* زَرْدَه et ar. زَرْد .

﴿اَوْهَدَمَا﴾ guttur.

﴿اَوْهَدَمَا﴾ carthamus *herba tinctoria*.

﴿اَفَ﴾ - ﴿اَوْهَدَمَا﴾ armatus, accinctus, promptus, solers, fortis, strenuus.

﴿اَوْهَدَمَا﴾ strenue.

﴿اَلْهَدَمَا﴾ strenuitas, velocitas.

﴿اَوْهَدَمَا﴾ proboscis, *cfr. هَمَدَ* .

زَرْزُورٌ et ﴿اَوْهَدَمَا﴾ sturnus, ar. زَرْزُورٌ .

﴿اَفَ﴾, fut. ﴿اَنْتَهَدَمَا﴾ laceravit, scalpsit, decorticavit.

Ethpe. ﴿اَوْهَدَمَا﴾ pass.

Pa. ﴿اَفَ﴾ id. ac *Pe.*

﴿اَهَدَمَا﴾ telum venenatum ; ventus urens.

﴿اَهَدَمَا﴾ — *Ethpal.* ﴿اَهَدَمَا﴾, superbivit, fastuose incessit.

﴿اَهَدَمَا﴾ et ﴿اَهَدَمَا﴾ revealendus, timendus ; *cfr. pers.* آزْرَم vis.

﴿اَهَدَمَا﴾ et ﴿اَهَدَمَا﴾ odorans *planta*.

﴿اَهَدَمَا﴾, *cfr. اَهَدَمَا*, آزْنِيَخَه, ar. زَرْنِيَخَه, arsenicum.

﴿زَرَاقَة﴾ camelopardus, ar. زَرَاقَة .

﴿اَفَ﴾, fut. ﴿اَنْتَهَدَمَا﴾ sparsit, dispersit ; seminavit ; trop. propagavit.

Ethpe. ﴿اَوْهَدَمَا﴾ pass.

Aph. ﴿اَفَ﴾ id. ac *Peal*.

﴿اَهَدَمَا﴾ sator, seinator.

﴿اَهَدَمَا﴾, pl. ﴿اَهَدَمَا﴾ et ﴿اَهَدَمَا﴾ semen ; granum ; proles, satum, seges ; tempus serendi ; ﴿اَهَدَمَا﴾ granum ; *planta pulicis* : psyllium *herba*. ﴿اَهَدَمَا﴾ *planta felis* : psyllium.

اوْهَنَا *dimin. præc. german,*
planta; *in pl.* olera.

اوْهَنَدَا proles, posteritas, *pl.*
اوْهَنَدَا.

اوْهَنَتَا seminalis.

اوْهَنَتَا *هَوْهَنَتَا* seminatus, sativus.

اوْهَنَ, *fut.* **اوْهَنَتَا** sparsit,
effudit.

Ethpe. **اوْهَنَفَ** *اوْهَنَفَ* pass.

اوْهَنَفَا scabies.

اوْهَنَفَا *sorbus* planta et fructus.

اوْهَنَفَا *camelopardus*, *ar.* زَرَاقٌ ;
cfr. supra **اوْهَنَفَا**.

اوْهَنَهَا *pluvia*, imber vehemens ;
flamma, *pl.* **اوْهَنَهَا**, *cfr. heb.*

אוֹהָן.

اوْهَנَהَا vehementer.

اوْهَنَهَا vis, impetus.

اوْهَنَ, *fut.* **اوْهَنَتَا** sparsit, effudit, dissipavit.

Ethpe. **اوْهَنَفَ** *اوْهَنَفَ* pass.

Aph. **اوْهَنَ** aspersit.

اوْهَنَهَا *اوْهَنَهَا*, *اوْهَنَهَا* dispersio.
اوْهَנָה disperse.

اوْهָןָה, *f.* **اوْהָןָה** cæruleus, *cfr.*
אוֹהָןָה *אוֹהָןָה* et **אוֹהָןָה**.

אוֹהָןָה cæruleus color.

אוֹהָןָה, *ar.* زَرَقَّ , cymba.

אוֹהָןָה *st. c.* **אוֹהָןָה**, *f.* ; *pl.* **אוֹהָןָה** et **אוֹהָןָה** spithama (*gall.* empan) ; *cfr.* *heb.* הַרְחֵב *id.* a *rad.* הַרְחֵב expandit.

אוֹהָןָה, *pl.* **אוֹהָןָה** placenta, sacrificia idolis aut dæmonibus oblata.

אוֹהָןָה buglossum *planta*.



هـ

هـ seu هـ octava littera
alphabeti; numerice valet هـ
vel هـ = 8, vel هـ = 8000,
هـ = 80000, هـ = 1/8,
هـ = octavus, etc. - Respon-
det هـ hebr. litterae هـ , et
ar. هـ et هـ , e. g. : هـ سـقـنـ ,
هـ خـفـرـ fodit, it. هـ سـقـنـ et هـ خـفـرـ , eru-
buit.

لـوـلـ ، st. c. لـوـلـ butyrum,
cremor lactis; cfr. heb. חַמָּה
et ar. خـمـ .

لـاـلـ ، v. s. سـلـ .
لـاـلـ raphanus.

لـاـلـ dactylus immaturus.

لـلـ ، v. s. سـلـ .

لـافـ vehementia, vis, impetus,
oppressio; galli cantus; adv.
impetuose, c. هـ ; - هـ اـفـ
et ar. هـ اـفـ هـ مـلـ هـ مـلـ impetum fecit,
irruit.

لـافـ vehemens, fortis, violen-
tus.

لـافـ vehementer, violenter.

لـافـ culex.

لـافـ fossa, canalis, vallum;
cfr. هـ وـهـ et هـ وـهـ .

لـاـلـ ، v. s. سـةـ .

لـاـلـ ، v. s. سـةـ .

سـخـ ، fut. نـسـخـ exarsit,
accensus est; trop. studio,
amore incensus est. Part. act.

سـخـ سـخـ . Part. pass. سـخـ ،
سـخـ .

Pa. سـخـ ardenter amavit,
complexus est, fovit, oscula-
tus est.

Ethpa. سـخـ pass.

Aph. سـخـ ، inf. هـسـخـ et nnq.
هـسـخـ amavit; ignem accen-
dit.

Ettaph. سـخـ pass.

سـخـ et سـخـ ardor, incen-
dium, pruritus.

سـخـ ، ignis materia, stipula,
sarmentum, quisquiliae.

سـخـ id.

سـخـ et سـخـ سـخـ accensio,
combustio.

سـخـ سـخـ combustioni aptus,
sarmentosus.

سـخـ ، ar. حـبـةـ ، ponderis mensu-
ra aequivalens fere 0, gr. 50.

سـخـ lignum minutum, stipula,

quisquiliae, *inde* res parvæ et viliores.

سَخْتَا , f. سَخْدَمَا di-
lectus, carus ; - subst. ami-
eus.

سَخْمَانَهُ amicc.

سَخْدَمَا amicitia, amænitas.

سَخْمَانَهُ amor, dilectio ;
calor, flamma.

سَخْدَمَهُ et سَخْنَمَهُ amanter.

سَخْدَمَهُ complexus.

سَخْتَنَهُ ex amore procedens,
amicus.

سَخْنَمَهُ et سَخْنَمَهُ, سَخْنَمَهُ amans, amator, dilector.

سَخْنَمَهُ dilectio, caritas.

سَخْدَمَهُ vel سَخْدَمَهُ , ar. خَابِيَةٌ , seria
vini, amphora.

سَخْدَمَهُ , pl. سَخْدَمَهُ tenebrae.

سَخْلَهُ , fut. سَخْلَهُ percussit,
cum ـ rei vel ـ pers. aut
rei; concussit, excussit ; - in-
trans. cecidit, ruit. Part. pass.
سَخْلَهُ ; - adj. vehe-
mens ; cfr. heb. סַחְלָה et ar.
خَبَطَ .

Ethpe. سَخْلَهُ pass.

Pa. سَخْلَهُ allisit, percussit,
concussit.

Ethpa. سَخْلَهُ pass.

سَخْلَهُ percussio, concussio,
excussio.

سَحْفَا pluvia vehemens.

سَحْفَهُما vehementia pluviarum.

سَحْفَهُمَا indumentum variii co-
loris.

سَحْفَهُمَّهُ baculus quo folia
executiuntur.

سَخْرَهُ , fut. سَخْرَهُ confudit,
misceuit, se miscuit ; c. ـ vel
ـ commiscuit, conjunxit ; cfr.
רַבֵּה et حَبَكَ complicuit.

Ethpe. أَسْخَرُ pass.

Pa. سَخْرَهُ commiscuit. Part.
pass. سَخْنَمَهُ ; - subst. pul-
mentum variis cibis commix-
tum.

Ethpa. أَسْخَرُ pass.

سَخْنَمَهُ ، سَخْنَمَهُ et سَخْنَمَهُ
confusio, mixtio,
conunctio.

سَخْنَمَهُ confusio.

سَخْنَمَهُ permixte.

سَخْنَمَهُ miscens ; mixtus.

سَخْلَهُ , fut. سَخْلَهُ concepit,
parturivit ; cfr. ar. حَيْلَهُ et heb.
הַלְּהָ ; trop. animo concepit.
Part. pres. سَخْلَهُ ;
f. prægnans, parturiens.

Pa. سَخْلَهُ corruptit, vitiavit ;
perdidit ; vastavit, peremit ;
intr. se corruptit, corruptus
est ; cfr. حَلَلَ ; - it. concipere

fecit, fornicatus est ; ut
Pe. parturivit. سَخْنَةٌ mortem sibi concivit. Part.
act. سَخْنَةٌ, pl. سَخْنَاتٌ, f. سَخْنَةٌ, st. c.
سَخْنَةٌ. Part. pass. سَخْنَةٌ,
مسَخْنَةٌ; adj. pravus, perversus.

Ethpa. سَخْنَةٌ pass. et reflex. ;
it. deflexit.

سَخْلٌ pler. in plur. سَخْلٌ dolor
presert. parturientis, partus ; abyssus.

سَخْلٌ funis, laqueus, funiculus ad metendum, inde pars, portio hæreditatis, tractus, regio. سَخْلٌ مَهْمَةٌ ora maritima. سَخْلٌ وَسْوَاءٌ radii ignis ; - trop. agmen, turba, series ; nnq. calamus scriptoris.

سَخْلٌ corruptio, perditio ;
ruina, destructio, سَخْلٌ بِلْهُ incorruptus : - adv. سَخْدٌ mihi ! سَخْدَهُ vae ei !

سَخْلٌ corruptor, maleficus ;
rapax ; it. restio.

سَخْلَانٌ misere, exitiali modo.

سَخْلٌ, pl. سَخْلَاتٌ debitum, inde retributio debita, officium ; foenus, usura.

سَخْلٌ corruptio, injuria, destructio, scortatio, stuprum ; trop. contagio, lues, poena.

مسَخْكَنٌ, fem. مَسَخْكَنَةٌ corrupiens, perdens, depravans ; corruptor, ferus ; - abortum produceens medicina.

مسَخْكَنٌ corruptibilis.

مسَخْكَنٌ مَسَخْكَنَةٌ corruptio, corruptibilitas.

سَخْدَلٌ سَخْدَلٌ herba sicut hedera arboribus adhaerens.

سَخْنَةٌ - Ethpa. سَخْنَةٌ et سَخْنَةٌ segnis, negligens fuit.

سَخْنَةٌ سَخْنَةٌ segnis, piger.

سَخْنَةٌ سَخْنَةٌ segnities, negligentia.

سَخْنَةٌ سَخْنَةٌ negligenter, ignave.

سَخْرَى , fut. سَخْرَى pressit, compressit ; se compressit turba, inde festinavit ad ; diligens fuit, institut ; - it. vocali (س) affecit litteram.

Ethpe. سَخْرَى pass. et reflex. - it. institut, studuit.

سَخْرَى compressio, densa turba ; - vocalis (س).

سَخْرَى pressio, turba.

سَخْرَى phaseolus, (gall. haricot).

سَخْرَى alumen.

سَخْرَى cibus ex farina, butyro et melle confectus, ar. خَيْصَةٌ id.

سَخْرَى vocalis (س) scriptio vel pronunciatio.

سَعْ amplexus ; *cfr. heb.* סְעֵה
et *syr.* حَمْفَتْ amplexus est.

مَعْنَى *inus*, *cfr. heb.* הַבָּרْ sociavit.

Pa. سَعْ socius fuit ; defixit
intente oculos.

Ethpa. سَعْ socius factus est,
conunctus est.

سَعْنَا, سَعْنَى, f. سَعْنَى socius,
proximus : *trop.* alius, alter,
quivis alius. كَسْعَنَى مُّوْدَدْنَا ex uno loco ad alterum.

سَعْنَى et rarius سَعْنَى socialis,
ad societatem spectans.

سَعْنَى societas, conjunctio.

سَعْنَى tenebræ ; atramentum ;
cfr. ar. حَبْرٌ.

سَعْنَى, pl. سَعْنَى vulnus, ulcus,
pus ; *trop.* culpa.

سَعْنَى incantator, divinator ; *it.*
caligo ; *fovea*, *cfr. ar.* حَفْرٌ.

سَعْنَى incantatio, divinatio.

سَعْنَى vapor, fumus.

سَعْنَى et سَعْنَى lana carmi-
nata; *buteo avis*, *ar.* حَبَارَى.

سَعْنَى avis aquatica.

سَعْنَى id. q. مَسْدَهْنَا.

سَعْنَى, fut. سَعْنَى clausit,
inclusit, *inde* obsedit ; c. سَعْنَى
obstrinxit ; *trop.* comprehen-
dit. Part. pass. سَعْنَى ; -
subst. reclusus, *ar.* حَيْسٌ ; f.

سَعْنَى reclusa : claustrum.

Ethpe. لَأْسَعْنَى inclusus est,
obsessus est ; se reclusit.

سَعْنَى inclusio.

سَعْنَى carcer.

سَعْنَى inclusio, obsidio, incar-
ceratio ; vita reclusi.

سَعْنَى includens, cohibens ;
in ambitu suo rem continens ;
custos careeris.

سَعْنَى fem. *præced.* ; it. inclu-
sio, carcer ; claustrum, cella
reclusi.

سَعْنَى, سَعْنَى, pl.
c. suff. سَعْنَى ئَوْنَى inclusio, *inde* obsidio, incarcera-
tio, carcer, vita claustral, claustrum. سَعْنَى سَعْنَى carcer,
cella reclusi, pl. سَعْنَى.

سَعْنَى reclusus, anachoreta.

سَعْنَى qui includi, cohiberi
potest ; inclusus.

سَعْنَى obsessor.

سَعْنَى planta ramis fecunda ;
pl. سَعْنَى mala persica.

سَعْنَى, pl. سَعْنَى scara-
baeus. سَعْنَى, pl. سَعْنَى id. ; hirudo.

سَعْنَى, pl. سَعْنَى festum, sole-
nitas, *inde* congregatio populi,
cortus ; *cfr. heb.* سَعْنَى saltatione sacra-

et ar. حَسْنَة peregrinationem sacram instituit.

Pa. حَسْنَة verb. denom. festum celebravit.

Ethpa. حَسْنَة لِ pass.

Aph. حَسْنَة allegorice exposuit; cfr. ar. حَسْنَة.

حَسْنَة solemnis, peregrinans ad festum agendum.

حَسْنَة, pl. حَسَنَاتِ templum idoli.

حَسْنَة et حَسْنَة festivitas.

حَسْنَة festivus.

حَسْنَة festalis, solemnis.

حَسْنَة festive, solemnri ritu.

حَسْنَة, pl. حَسَنَاتِ spina; sentis.

حَسَنَة fanum, templum idolorum; idolum.

حَسْنَة et حَسْنَة cubicularius; ar. حاجب.

حَسَنَة, fut. حَسَنَة circumdedit, circumivit. Part. pass. حَسَنَة sinuosus.

حَسَنَة, حَسَنَة et حَسَنَة circuitio.

حَسَنَة, حَسَنَة, f. حَسَنَة perdx.

حَسَنَة - Pa. حَسَنَة claudicavit.

حَسَنَة chœrogryllus, hyrax.

حَسَنَة claudus.

حَسَنَة claudicando.

حَسَنَة claudicatio.

حَسَنَة, fut. حَسَنَة impedivit, cohibuit; c. fut. حَسَنَة claudicavit. Part. pass. حَسَنَة; - adj. claudus, mancus.

Ethpe. حَسَنَة لِ pass.; claudus factus est.

Pa. حَسَنَة impedivit; claudum, mancum reddidit; claudicavit.

Ethpa حَسَنَة id. q. Ethpe.

Aph. حَسَنَة claudum reddidit; claudicavit; trop. in sermone hæsit.

حَسَنَة prohibitio; claudicatio.

حَسَنَة claudus, paralyticus.

حَسَنَة et حَسَنَة claudicatio.

حَسَنَة circuitio.

حَسَنَة claudicando.

حَسَنَة a rad. حَسَنَة, ar. حَسَنَة, unus, una, unum; nnq. pri-

mus, v. g. حَسَنَة primus in hebdomada: dies dominica;

quidam. حَسَنَة vir quidam.

حَسَنَة, unius. حَسَنَة nemo; alter ut حَسَنَة; una pars.

حَسَنَة pars quinta. Varii sunt usus حَسَنَة, sumitur:

1° distributive. حَسَنَة unus-

quisque, singuli ; سِبَّ حَسْبٌ inter se ; c. وَ , سِبَّ وَ سِبَّ alter alterius. سِبَّ حَسْبٌ alter alterum. سِبَّ مِنْ سِبَّ ab invicem; pl. contr. سِبَّوْنَا invicem, et inde سِبَّوْتَأْ , f. سِبَّوْتَأْ nonnulli, pauci, pauca.

2º multiplicative دَوْلَةٌ duplex, secunda vice, etc., vel c. دَاهْدُهَا , c. دَاهْدُهَا quadruplum ; دَاهْدَهَا centuplum.

3º adverb. temp. سِبَا primum ; سِبَا سِبَا una alteraque vice ; سِبَا كَحْمَهَا vel سِبَا كَحْمَهَا raro, interdum ; سِبَا حَثْهَهِ rarissime ; سِبَا كَلْهَهَا semel post longum intervallum; سِبَا هُنْ et contr. سِبَا vel هُسْبَا statim. أَمْ سِبَا مُسْبَا وَ simul ac. سِبَا مُسْبَا sim. ut uno verbo dicam. سِبَا vel سِبَا quanto magis ; seq. لِـ quantominus. سِبَا هُنْ seorsim.

أَنْ ، pl. سِبَّةٌ unitas, unio ; solitudo.

سِبَّةٌ , singularis, unicus, solitarius ; trop. eximus. سِبَّةٌ Monophysitae.

سِبَّةٌ singulari numero, singulariter ; trop. excellenter.

سِبَّةٌ singularitas, unitas; ap. gramm. numerus singularis.

Pa. سِبَّ verb. denom. univit, conjunxit, copulavit, Part. act. حَسْبَنْ . Part. pass. حَسْبَنْ .

Ethpa. سِبَّا pass.

دَسْبَأْ junctim, actione com- muni.

دَهْمَهَا unio, unitas.

دَهْمَهَا unitivus.

دَهْمَهَا quod uniri potest.

دَهْمَهَا unitas, unionis capacitas.

دَهْمَهَا , confl. ex سِبَّ et دَهْمَهَا , solus, sola, solum ; solet post se suffixa plural. habere. دَهْمَهَا ego solus. دَهْمَهَا tu solus, etc.; adverb. seorsim, solum; -c. دَهْمَهَا et deriv. v. s. دَهْمَهَا .

دَهْمَهَا solus, unicus ; singula- ris, solitarius.

دَهْمَهَا seorsim.

دَهْمَهَا unitas, unicitas ; sin- gularitas ; numerus singula- ris ; solitudo, vita solitaria.

سِبَا et سِبَا , fut. نِسْبَا gavisus est, latatus est. Infinit. هُسْبَا ; part. act. سِبَا , سِبَا ; dicitur سِبَا vel سِبَا latus sum. مَحَلْ مَسْبَبَ libenter et late animo accepit. فِي سِبَا gau- dendo.

Pa. لَتِيفَاتٍ lætificavit ; congratulatus est *c.* لَتِيفَةً .

Ethpa. لَتِيفَاتٍ pass.

Aph. لَتِيفَاتٍ id. ac *Pa.*

لَهْوٌ , لَهْوٌ st. cst. لَهْوٌ gaudium, lætitia ; horrea subterranea, *pl.* لَهْوٌ ; *trop.* festivitates ; *cfr.* *rad.* سَبَقْ .

لَهْوٌ et لَهْوٌ لَهْوٌ lætus.

لَهْوٌ læte.

لَهْوٌ لَهْوٌ lætificans, exhilarans, lætus.

لَهْوٌ exhilaratio.

لَهْوٌ lætificans ; lætitiam exprimens.

لَهْوٌ , *pl.* لَهْوٌ et لَهْوٌ pectus ; *c. suff.* لَهْوٌ , لَهْوٌ , *in pl.* f. ova. لَهْوٌ et لَهْوٌ لَهْوٌ pectorale ; lorica ; *cfr.* *heb.* חַזָּה .

لَهْوٌ et rarius لَهْوٌ , cichorium.

لَهْوٌ , *pl.* لَهْوٌ socius sponsi, sodalis, invitatus ad nuptias, conviva ; ipsa invitatio ad nuptias, convivium nuptiale, dies festivus.

لَهْوٌ fem. præced.; socia sponsi *vel* sponsæ.

لَهْوٌ officium socii sponsi. لَهْوٌ luscinia.

لَهْوٌ , fut. لَهْوٌ et لَهْوٌ .

circumivit, *c. acc. vel* لَهْوٌ , inde mendicavit ; circumdedit, ob-sedit ; seq. al. verbo fungitur officio adv. : iterum. حَدَّةٌ حَدَّةٌ iterum fecit hoc. Part. act. لَهْوٌ لَهْوٌ ; subst. in f. emph. لَهْوٌ لَهْوٌ vel لَهْوٌ لَهْوٌ , *pl.* لَهْوٌ لَهْوٌ peribolus, circuitus ; vestibulum, conclave rotundum, contignatio; compedes. دَرْجَةٌ دَرْجَةٌ circumvolvendo, per orbem. Part. pass. لَهْوٌ لَهْوٌ , circumdatus ; active cingens.

Ethpe. لَهْوٌ لَهْوٌ circumdatus est ; mendicatus est.

Etph. لَهْوٌ لَهْوٌ circumire fecit, circumdedit, cinxit, se einxit ;

seq. دَرْجَةٌ retribuit; *adv. ut Pe.* لَهْوٌ لَهْوٌ circuitio, circuitus,

circulus, mendicatio ; *pl.* لَهْوٌ لَهْوٌ loca circumstantia ; *adverb.*

لَهْوٌ لَهْوٌ vel لَهْوٌ لَهْوٌ circa, juxta, prope ; *c. aff.* لَهْوٌ لَهْوٌ circa me,

لَهْوٌ لَهْوٌ circa illum ; دَرْجَةٌ دَرْجَةٌ in variis locis.

لَهْوٌ لَهْوٌ mendicatio.

لَهْوٌ لَهْوٌ circuitio, mendicatio.

لَهْوٌ لَهْوٌ cardo januae ; ansula chlamydis.

لَهْوٌ لَهْوٌ cinctio.

لَهْوٌ لَهْوٌ , *pl.* لَهْوٌ لَهْوٌ circulus,

globus ; *inde* cœtus, schola ;
ordo officiorum per annum
decurrentium ; circus.

مـ دـ وـ زـ مـ dimin. circulus parvus.
مـ دـ وـ زـ مـ in circuitu, in orbem,
circumquaque.

مـ دـ وـ زـ مـ circularis.

مـ دـ وـ زـ مـ figura sphærica.

مـ دـ وـ زـ مـ circumiens.

مـ بـ - Pa. لـ بـ renovavit,
instauravit, innovavit ; dedi-
cavit ; novum quid in lucem
edidit. بـ تـ بـ novos cano-
nes edidit. بـ تـ بـ دـ نـ de novo
aedificavit.

Ethpa. لـ بـ لـ pass. ; it. de novo
exstitit.

Ettaeph. لـ سـ لـ l rennovatus est.
لـ بـ ، لـ بـ novus, recens, pl.
اـ لـ بـ ; - subst. tyro, f. emph.
اـ لـ بـ , subaud. مـ دـ مـ audit :
Novum Testamentum; recens
nupta mulier ; in pl. اـ لـ بـ
novitates ; cfr. ar. حـ دـ تـ .

اـ لـ بـ , st. c. لـ بـ , pl. اـ لـ بـ
novitas ; res nova, inaudita.

اـ لـ بـ pro اـ لـ بـ sponsa.
اـ لـ بـ nove, recenter, nuper.
اـ لـ بـ initatio, renovatio, res-
tauratio ; dedicatio ; pl. اـ لـ بـ
novae res.

اـ لـ بـ مـ سـ بـ renovator.

مـ دـ بـ تـ بـ renovandus.

اـ لـ بـ - Pa. بـ مـ monstravit,
indicavit, edidit, protulit, ins-
tituit : seq. مـ تـ بـ se professus
est ; c. dupl. acc. بـ مـ اـ لـ بـ مـ
خـ مـ aliquid eis ostendit ;
بـ مـ خـ مـ اـ لـ بـ præmonstravit.
Part. act. مـ تـ بـ مـ , مـ تـ بـ مـ ;
مـ تـ بـ مـ pro بـ لـ ego ostendam.
Part. pass. مـ تـ بـ مـ demonstratus ; pl. cst. مـ تـ بـ مـ .
Ethpa. بـ مـ اـ لـ بـ pass. et reflex.
مـ تـ بـ مـ , demonstratio, manifes-
tatio.

مـ تـ بـ مـ instrumentum ad libran-
das aquas, speculum astro-
labi.

مـ تـ بـ مـ , f. مـ تـ بـ مـ demonstrativa
demonstrans, demonstrativus : in-
terpres ; subst. stragulum quo
se quis tegit : dentiscalpium,
pl. f. مـ تـ بـ مـ ; demonstra-
tiones, argumenta.

مـ تـ بـ مـ demonstratio, in-
dubitatum argumentum , pl.
مـ تـ بـ مـ .

مـ تـ بـ مـ apodicticus.

مـ تـ بـ مـ indicatio : manifes-
tatio, pl. مـ تـ بـ مـ .

مـ تـ بـ مـ demonstrative.

مـ تـ بـ مـ , pl. مـ تـ بـ مـ demon-
stratio, specimen, ar-

gumentum, exemplum; exemplar.

لَهْمٌ, c., pl. لَهْمَاتٌ, ar. حَيَّةٌ, serpens; trop. diabolus.

لَهْمَانٌ serpentium incantator.

لَهْمَانٌ triticum repens.

لَهْمَانٌ f., serpens.

لَهْمَانٌ anguiculus.

لَهْمَتٌ, fut. لَهْمَتْ defecit, ar. خَابَ, inde c. مُهْ vicius est, impar inventus est; reus fuit, deliquit, ar. خَابَ, inde debitor factus est, debuit; لَهْمَكَ deliqui. Part. præs. لَهْمَانٌ, سَادٌ vicius, impar; inpers. debetur, oportet.

Ethpe. لَهْمَانٌ damnatus est; debitus est. لَهْمَانٌ حَكَ nobis inceumbit onus. مَهْمَنْهَهْ pœnam mereatur.

Pa. لَهْمَتٌ vicit; reum fecit, damnavit. Part. act. مَهْمَنْهَهْ, مَهْمَنْهَهْ damnans. Part. pass. مَهْمَنْهَهْ damnatus, reus.

Ethpa. لَهْمَانٌ vicius est; reus fuit, reum se agnovit, damnatus est.

لَهْمَانٌ, pl. m. لَهْمَاتٌ, et لَهْمَانٌ, st. c. لَهْمَانٌ, f. لَهْمَانٌ debitum, reatus; delictum; لَهْمَانٌ veetigalia.

سَعْدٌ, v. s. سَعْدٌ.

سَعْدٌ سَعْدٌ condemnatio.

سَعْدٌ سَعْدٌ reus, debtor; qui debet aliquid, qui tenetur.

لَهْمَانٌ مَهْ مَهْ morte dignus.

لَهْمَانٌ مَهْ reatus, condemnatio; defectus, clades.

مَسْعَدٌ مَسْعَدٌ condemnatio.

مَسْعَدٌ مَسْعَدٌ reum faciens.

مَدْهَانٌ مَدْهَانٌ debita res; - subst. debitum.

مَدْهَانٌ مَدْهَانٌ ex debito, necessario.

لَهْمَانٌ, fut. لَهْمَانٌ circumivit, circumegit; c. مُهْ cavit, reveritus est; erubuit.

Ethpe. لَهْمَانٌ circumivit.

Pa. لَهْمَانٌ circumivit.

لَهْمَانٌ circuitio.

لَهْمَانٌ, st. c. لَهْمَانٌ circulus; globus, sphæra, pl. لَهْمَانٌ et لَهْمَانٌ.

لَهْمَانٌ لَهْمَانٌ circularis, sphæricus.

لَهْمَانٌ لَهْمَانٌ ut لَهْمَانٌ; it. quidquid circumdat ut velum, septum.

لَهْمَانٌ لَهْمَانٌ pl. لَهْمَانٌ tiara, diadema.

لَهْمَانٌ لَهْمَانٌ urbs munita, cfr. ar. حَوْزٌ septum.

لَهْمَانٌ لَهْمَانٌ fut. سَعْدٌ promptus, alacer fuit; gavisus est.

Ethpa. لَهْمَانٌ id.

الْمَسْنُوٌ سَمْسَنْيَا alacris, promptus, laetus.

الْمَسْنِيٌّ سَمْسِنْيَا alacriter, laete.

الْمَسْنَى سَمْسَنْيَا alacritas, hilaritas.

الْمَسْنَى سَمْسَنْيَا suspirium.

الْمَسْنَى سَمْسَنْيَا , ar. خَزْنَةٌ , prunus.

الْمَسْنُوٌ سَمْسَنْيَا , fut. مَسْنَى assuit, consuit, resarcivit; cfr. heb. מִזְנָה et ar. خَاطَ .

Ethpe. الْمَسْنَى pass.

Pa. الْمَسْنَى ut Pe.; it. metaph. contexit.

Ethpa. الْمَسْنَى pass.

الْمَسْنَى سَمْسَنْيَا sutura.

الْمَسْنَى سَمْسَنْيَا , ar. خَيْطٌ , filum, filum mensoris, funiculus; fascia.

الْمَسْنَى سَمْسَنْيَا et الْمَسْنَى سَمْسَنْيَا lenocinium.

الْمَسْنَى سَمْسَنْيَا sartor.

الْمَسْنَى سَمْسَنْيَا ars sartoris.

الْمَسْنَى سَمْسَنْيَا sutura.

الْمَسْنَى سَمْسَنْيَا ut الْمَسْنَى سَمْسَنْيَا a سَهْنَى , acus.

مسْ fricuit, id. q. سَ .

Ethpe. الْمَسْنَى Scalptus est.

الْمَسْنَى textor; ar. حَائِكٌ .

الْمَسْنَى سَمْسَنْيَا , ar. خَزْنَةٌ , ocyrum basilicum.

الْمَسْنَى سَمْسَنْيَا , vide سَلْلَا .

الْمَسْنَى سَمْسَنْيَا , v. s. سَهْنَى .

مسْ misertus est, vide سَ .

مسْ سَمْسَنْيَا , fut. سَمْسَنْيَا misertus est, pepercit, c. سَ ; seq. مُنْ vel , et fut. abstinuit; impers. absit, c. سَ vel , et fut.: سَ لُوكْتَ , absit ut hoc fiat; cfr. ar. حَاتَ .

مسْ سَمْسَنْيَا misericordia, miseration; parcimonia.

مسْ سَمْسَنْيَا misericorditer.

مسْ سَمْسَنْيَا et سَمْسَنْيَا misericors, indulgens.

مسْ سَمْسَنْيَا misericorditer.

مسْ سَمْسَنْيَا misericordia, indulgentia; sollicitudo.

مسْ سَمْسَنْيَا , v. s. سَهْنَى .

مسْ سَمْسَنْيَا , fut. سَمْسَنْيَا detersit, lavit.

مسْ سَمْسَنْيَا et سَمْسَنْيَا lotura, detersio.

مسْ سَمْسَنْيَا lavaerum.

مسْ سَمْسَنْيَا ars detersoris.

مسْ سَمْسَنْيَا , v. s. سَهْنَى .

مسْ سَمْسَنْيَا , fut. سَمْسَنْيَا strinxit, constrinxit, inde coarctavit, roboravit; intr. convaluit. سَمْسَنْيَا سَمْسَنْيَا accelerata pedibus: festina. Part. pass. سَمْسَنْيَا , سَمْسَنْيَا , constrictus; adj. robustus.

Ethpe. الْمَسْنَى pass.

Pa. سَمْسَنْيَا constrinxit; metaph.

confortavit ; *ap. gramm.* literam reduplicavit.

Ethpa. إثپا ل past.

شُرْعَةٌ constrictio ; linteum, fasciae ; reduplicatio litteræ.

شُرْعَةٌ constrictio ; reduplicatio litteræ ; fascia.

شُرْعَةٌ arête ; *trop.* valide, alacriter.

شُرْعَةٌ , pl. شُرْعَاتٌ strictio, coaretatio ; *trop.* energia, vires. حَسْنَةٌ valide.

شُرْعَةٌ spatha palmæ, *ar.* خُوصٌ ; tugurium arundineum.

مُحَسِّنٌ constringens, stypticus.

مُصْرِفٌ , fut. شُرْعَةٌ strepuit, stridorem reddidit.

شُرْعَةٌ et شُرْعَةٌ strepitus januae.

شُرْعَةٌ gradus scalæ, scala.

شُرْعَةٌ , pl. شُرْعَاتٌ linea.

Ethpa. مُصْرِفٌ v. denom. a شُرْعَةٌ , in gradus ordinatus est, in partes divisus est.

شُرْعَةٌ , fut. شُرْعَةٌ aspexit, res pexit, intuitus est, consideravit ; *trop.* attendit ad, exspectavit, petiit, spectavit res ad c. حَدَّ ; c. حَوْلٍ præcavita ; seq. حَتَّى et حَتَّى p., oculo aspexit invidioso. Part. act. شُرْعَةٌ , f. شُرْعَةٌ .

Ethpe. شُرْعَةٌ pass.

Aph. شُرْعَةٌ videre, perspicere fecit, monstravit ; *trop.* directit ad ; sollicitavit, c. , seq. fut. ; it. vidit.

شُرْعَةٌ شُرْعَةٌ aspectus, intuitus, visus.

شُرْعَةٌ شُرْعَةٌ visus, intuitus ; aspectus, spectaculum ; exemplum, exemplar ; animalaniculum ; populus alba ; carbo extinctus. حَسْنَةٌ شُرْعَةٌ spectaculum.

شُرْعَةٌ شُرْعَةٌ visus, consideratio ; scopus.

شُرْعَةٌ شُرْعَةٌ curiose spectans, oculo invido aspiciens ; *trop.* avidus.

شُرْعَةٌ شُرْعَةٌ foramen, fissura.

مُحَسِّنٌ شُرْعَةٌ provide.

شُرْعَةٌ شُرْعَةٌ , f. emph. شُرْعَةٌ albus ; subst. albumen ovi ; in f. emph. vitis species ; alnus, pinus ; piper album ; moneta argentea ; pl. m. albæ vestes. حَدَّا شُرْعَةٌ hebdomas albarum ; pl. f. شُرْعَةٌ canities.

شُرْعَةٌ شُرْعَةٌ , fut. شُرْعَةٌ v. denom. a præc. albus fuit vel factus est.

Pa. شُرْعَةٌ dealbavit.

Ethpa. شُرْعَةٌ pass.

- | | |
|---|--|
| Aph. أَهْدَى dealbavit. | شَاهِدٌ facultas videndi, visio. |
| أَهْدَى albedo, dealbatio. | شَاهِدٌ videns; subst. Videns, |
| أَهْدَى albedo; trop. oculorum
immodestia. | شَاهِدٌ Propheta. |
| أَهْدَى ex argilla molli et alba
constans, f. أَهْدَى alba
populus. | شَاهِدٌ caligo oculorum. |
| أَهْدَى albedo, via lactea;
albugo oculi; adj. albicans, f.
أَهْدَى, pl. أَهْدَى | شَاهِدٌ videns. spectator;
trop. sapiens, propheta. |
| أَهْدَى , fut. أَهْدَى vidit, provi-
dit, invisit, exploravit; trop.
præcavit. Part. act. أَهْدَى, شَاهِدٌ,
f. emph. شَاهِدٌ, pl. شَاهِدٌ; -
subst. oculi. Part. pass. أَهْدَى, شَاهِدٌ;
adj. visibilis, conspi-
cuus. مُهْدَى لَمْ يَرَ أَهْدَى حَلْفٌ
neminem vidit. شَاهِدٌ qui te
vident. | أَهْدَى visus, visitatio;
conspectus, vultus: species,
spectaculum; exemplar. كَفَّارٌ eum salutatum
adivit. مُهْدَى وَنَانَا urbs
visu digna, speciosa. |
| Ethpe. أَهْدَى visus est, se vi-
dendum præbuit, astitit; vi-
sum recepit. أَهْدَى سَكُونٌ
fortem se exhibuit. Impers.
كَبَّ أَهْدَى mihi visum est. | شَاهِدٌ palam, in conspectu. |
| أَهْدَى وَجْهَهُ أَهْدَى videtur esse. | شَاهِدٌ actio videndi. |
| أَهْدَى visus. | مُهْدَى, c. حَدَّ usurp., visus. |
| أَهْدَى, pl. أَهْدَى | مُهْدَى et مُهْدَى spectaculum: speculum. |
| أَهْدَى translucens, pelluci-
dus. | مُهْدَى translucens, pelluci- |
| أَهْدَى مُهْدَى visibilis. | شَاهِدٌ visibilis. |
| أَهْدَى مُهْدَى apparitio. | مُهْدَى visibilitas, apparitio. |
| أَهْدَى مُهْدَى visibili modo. | مُهْدَى visibili modo. |
| Ethpau. أَهْدَى in spectacu-
lum se præbuit; gloriatus
est, c. كَبَّ. | أَهْدَى in spectaculo se exhibuit; |
| أَهْدَى superbiens. | أَهْدَى ostentatio. |
| أَهْدَى jactanter. | أَهْدَى dolium, aquæ puteus. |
| أَهْدَى ostentatio. | أَهْدَى species piscis. |
| أَهْدَى fissura; trop. abyss-
sus; cfr. ar. حَرَّ incedit. | أَهْدَى fissura; trop. abyss- |

ī̄, *ī̄̄* seabie affectus.

لِأَوْتُرْ profectio.

|^الْمِنَ vel |^الْمِنَ scabies;
lichen *herba.*

مُهَاجِرَة profectio, migratio;
extasis, mors.

ضَلَّ - *Inusit. efr. ar. حَزَمْ*
strinxit.

الْمَسْنَدُ cingulum.
الْمَسْنَدُ accinctio.

سُرْدٌ surdus; cingulo præcinctus.

حازر سُدُوْنَا farina ; cfr. ar. سَوْمَةٌ سَوْمَةٌ vel سَوْمَةٌ farinarius.

جَزَّامٌ سِنْدَلٌ *cingulum jumenti, ar.*

果，¹ malus *arbor et fructus*; sphærula, capitellus.

अस्तु - Ethpe. अस्तु asper
factus est.

مَلُوْكٌ، مَلُوكٌ، malus aurea;
مَلُوكٌ، مَلُوكٌ، malus armeni-

Pa. ۹۷ asperum reddidit.

aca. مَلْعُونٌ وَّمَنْجُولٌ et مَلْعُونٌ حَنْدًا mespilus. مَنْجُولٌ مَهْمَمٌ malum

אָשֵׁר, הַאֲשֵׁר asper, durus,
crassus.

citreum. مَلُوْجُونا فَحْصَمْا malus
persica. فَحْصَمْا مَلُوْجُونا cu-

11 *laçot* asperitas.

cumeres. سُلْعَةٌ فَخْرٌ genæ.
سُلْعَةٌ sulcus in arena.

مَلَكٌ, *fut.* مَسْهَدٌ *cinxit, strin-*
xit; intr. iter facit, migravit.

Part. act. **cingens**,
se cingens; iter faciens. *Part.*
pass. **cinctus**; *it. act.*
cingens.

Pa. ~~scilicet~~ accinxit, se accinxit
ad iter, abire fecit; *trop.* cor-
roboravit.

aper sylvestris; *trop. fatuus*;
pl. f.  *scrophulæ*.

Ethpa. ~~εἴτε~~ ^{τι} ~~τι~~ ^{τι} ~~τι~~ pass. et refl.

لَعْنَد porcinus; spurius, foetens; gulosus, libidinosus.

سُمْكٌ actio accingendi, cingulum; vinculum; trop. vis, robur.

لَوْمَةٌ porcina crudelitas.
سُرْفُوا subuleus.

مُوْتَ migrans, viator; fascia;
membrana.

 Junius mensis.
 , pl.  prunus, cfr.

وَمَسْأَلَةٌ، مَسْأَلَةٌ viator.

supra *laco*.
|^o⁴^d^v| *laco* prunum.

سْهَفَأْ سَهْفَأْ celeriter.

سْهَفَعَا raptus; extasis.

سْهَفُنَا raptor.

سْهَفَدَا segmentum.

سْهَفَدَا ut مَسْهَدَا , variegata tunica.

سْهَنَةْ , fut. سَهْنَةْ percussit fuste, virga.

Ethpa. نَاهَنَلِي virgis caesus est.

سْهَنَةْ et سَهْنَةْ carminatio.

سْهَنَةْ , f. نَاهَنَلِي carminator; in f. arcus carminatoris; gibbus, elatus terrae locus.

سْهَنَةْ carminator.

سْهَنَةْ , سَهْنَةْ , ar. خطر, heb. הבָּרְכָּה baculus, virga, pl. سَهْنَةْ et سَهْنَةْ .

سْهَنَةْ denom. praece. vapulavit; baculo innixus est.

سْهَنَةْ et نَاهَنَلِي gibbus, gibbus camelii.

سْهَنَةْ et نَاهَنَلِي gibbosus.

سْهَنَةْ , v. s. سَهْنَةْ .

سْهَنَةْ , fut. نَاهَنَلِي , نَاهَنَةْ et نَاهَنَةْ , verb. irreg. flectitur in praet. سَهْنَةْ , f. سَهْنَةْ , 2^a p. سَهْنَةْ , 3^a pl. سَهْنَةْ , f. سَهْنَةْ ; in fut. سَهْنَةْ , f. سَهْنَلِي , 2^a p. سَهْنَةْ , f. سَهْنَلِي , 3^a pl. سَهْنَةْ , f. سَهْنَةْ , 1^a p. سَهْنَلِي , pl. c. سَهْنَةْ ;

in imp. سَهْنَةْ , f. سَهْنَةْ , pl. سَهْنَةْ ; inf. سَهْنَةْ , سَهْنَةْ et مَهْنَةْ , vixit; salvus factus est, revixit; convaluit. Part. act. سَهْنَةْ , f. سَهْنَةْ , pl. سَهْنَةْ vel سَهْنَةْ . f. سَهْنَةْ ; سَهْنَةْ in aeternum vive. سَهْنَةْ valete.

سَهْنَةْ سَهْنَةْ حَمْنَةْ inique viventes.

Aph. سَهْنَلِي , fut. سَهْنَلِي et نَاهَنَلِي vi- vere fecit, vivum servavit; vitae restituit; vivificavit, restauravit. سَهْنَلِي Interj. vivi- fica me: euge! Part. act. مَهْنَةْ et مَهْنَةْ , st. c. مَهْنَةْ , pl. مَهْنَةْ , f. مَهْنَةْ . Part. pass. مَهْنَةْ , inf. مَهْنَةْ .

Ettaph. نَاهَنَلِي et نَاهَنَلِي vivi- ficatus est.

سَهْنَةْ , emph. سَهْنَةْ , pl. سَهْنَةْ , سَهْنَةْ , emph. سَهْنَةْ , pl. سَهْنَةْ , f. سَهْنَةْ vivus, vivens; crudus de carne, me- rus de vino, viva et pura de aqua; in f. emph. obstetrix. فَنَ حَكَمَ اكْتَنَرْ وَلَا سَهْنَةْ dives sollicitus est de annis in quibus non vivet. - it. subst., st. c. سَهْنَةْ , vivificatio, revi- viscentia; adv. vive, crude. سَهْنَةْ لَيْلَةْ per vitam meam. سَهْنَةْ تَلَيْلَةْ per vitam tuam. سَهْنَةْ حَنْتَنَا pincerna. سَهْنَةْ اَتَنْ aeternus. سَهْنَةْ حَكَمَهْ sem- perviva planta, *Asplenium*. سَهْنَةْ

مَحْدَداً resurrectio mortuorum.
 مَتَّ vel مَتَّ semper in pl.
 vita, c. aff. مَتَّ vita mea.
 مَتَّ vita tua, etc.; salus,
 jurisjurandi forma. لَا مَسْتَحْدِهُ
 non per vitam vestram. مَنْ
 مَسْتَهْدِهُ dum vivit.

Liqueur vive; crude.

سَمَّهُ، لِأَنَّهُ animalitas، vita.

سَمَاءٌ, **سَمَاءاً** c. animal, coll. animalium genus, st. c. **سَمَاء**, pl. **سَمَاءاً**; **سَمَاءاً** **كُفَّارًا** bestia alata, spec. aves rapaces;

سَمَّاً وَهُنَّا fera arundinis : bubalus. هُنَّا animal rapax. سَمَّاً بِرْحَدًا animalia zoophyta. وَخُنَّا ferae sylvestres. سَمَّاً وَأَوْدَدَهُ سَمَّاً وَرَكْبَهُ quadrupedia. سَمَّاً وَجَنْبَهُ jumenta. سَمَّاً وَهَمَنَّا animalia cieuria. سَمَّاً وَهَلْمَنَّا et animalis, ferus. سَمَّاً وَهَلْمَنَّا facultates vitales.

animaliter animaliter, feriter.

|Lai Lai feritas.

مَسْنَدٌ et **مَسْنَدًا** vivificans,
vivificator; f. emph. **مَسْنَدًا**.

Lamia vivificatio.

لَا مِنْهُمْ مَنْ يَعْلَمُ et لَا يَعْلَمُونَ, v. s. لَا .

سَكَنَ, **سَكَنَةً**, *c. aff.* **سَكَنَ**,
pl. **سَكَنَاتٍ**, **سَكَنَةً**, **سَكَنَاتًا**,

robur, vis; vires, exercitus;
 trop. virtus, vis *verbi*, faculta-
 tas, opes: miracula. **جَهْنَمَ**
يَحْنَمَ سَدْهَنَ مَلَمَ vel vir fortis,
 heros. c. **فَلَّا** omnipotentia.
 adv. **حَسْلَا**, fortiter.
 et **دَسْلَا**, juxta, secundum.
تَذَهَّبَ مَنْدَهَنَ تَذَهَّبَ summis viri-
 bus. **حَسْلَا وَكَهْنَمَ** Dei ope.
أَمْبَهَنَ تَذَهَّبَ pro mea virili
 parte. **تَهْنَهَهَ وَتَهْنَهَهَ** surgere
 valet. **نَاهْنَهَهَ مَلَمَ** viribus
 valuit, par fuit.

Pa. ~~v.~~ v. *denom.* roboravit,
confirmavit, confortavit.

Ethpa. ~~υλι~~ pass. *roboratus*
est: *fortis fuit, fortiter se
gessit, valuit, prævaluit.*

imploratio auxilii.

سَكَّهَا , pl. سَكَّهَاتْ vires : exercitus: virtutes, miracula.
 سَكَّهَا لَا مُهَمَّاتْ virtutes
 invisibles : Angeli. لَوْكَاهْ
 سَكَّهَا , Deus exercitum.
 سَكَّهَا corroboratio : robur, vir-
 ius.

سَلْطُونٌ et **سَلْطَانٌ**. **سَلْطُونٌ**, robustus, potens : fortis, strenuus : *it. spec. c.*
فَعِيلٌ omnipotens : *adv. potissimum.* **فَعِيلٌ سَلْطُونٌ** potentior.
سَلْطَانٌ فَعِيلٌ سَلْطُونٌ Sanctus, Fortis
in Trisagio.

سَخَدْنَاهُ اَلْتَهَمَّتَهُ et سَخَدْنَاهُ مَهَّدَنَاهُ valide; virtualiter.

سَخَدَهُ اَلْتَهَمَّتَهُ et سَخَدَهُ اَلْتَهَمَّتَهُ vis, robur, praestantia.

سَخَكْنَاهُ roborator.

سَخَلَهُ اَلْتَهَمَّتَهُ et deriv., v. s. سَخَلَهُ . سَخَلَهُ , v. s. سَخَلَهُ .

سَخَمَهُ cognatio, a verbo سَخَمَهُ .

سَخَنَاهُ id. q. اِسْتَهَمَّتَهُ , vide سَخَلَهُ .

سَخَفَ culices, i. q. سَخَفَ .

سَخَنَاهُ conventus, cœnobium; castrum. cfr. ar. خَيْرٌ septum. سَخَنَاهُ nomen octavae litterae Syrorum.

سَخَنَاهُ , fut. سَخَنَاهُ seabit, fricuit; rasit.

Pa. سَخَنَاهُ id.

سَخَنَاهُ et سَخَنَاهُ scabies.

سَخَنَاهُ , cfr. infra سَخَنَاهُ , ar. حَنَّةٌ , palatum.

سَخَنَاهُ . fut. سَخَنَاهُ scivit, cognovit; cognovit mulierem.

Part. pass. سَخَنَاهُ , سَخَنَاهُ cognitus. كَحْنَاهُ لَا سَخَنَاهُ كَهُ hominem non cognosco.

Pa. سَخَنَاهُ sapientem fecit, edocuit; cognovit mulierem.

Ethpa. سَخَنَاهُ pass.; it. sapienter se gessit; arte usus est, machinatus est.

سَخَنَاهُ , emph. سَخَنَاهُ , st. c. سَخَنَاهُ notitia, judicium, consilium, scientia; it. sed spec. in st. emph. sapientia, ars, philosophia. سَخَنَاهُ sapienter; dolose.

سَخَنَاهُ sapiens.

سَخَنَاهُ scientificus, intellectualis; sapientialis.

سَخَنَاهُ concubitus.

سَخَنَاهُ sapiens, doctus, peritus; astutus, magus; f. pl. سَخَنَاهُ præfice (gall. pleureuses).

سَخَنَاهُ sapienter.

سَخَنَاهُ sapientia, scientia: it. coitus.

سَخَنَاهُ , سَخَنَاهُ commentum; doctrina, subtilitas; dolus.

سَخَنَاهُ , pl. سَخَنَاهُ co-gnatus, familiaris; hæreditatem fratri stabiliens ei suscitando semen.

سَخَنَاهُ sophista; doctor.

سَخَنَاهُ eruditio, sapientia.

لَحْنَاهُ لَحْنَاهُ lac; succus.

لَحْنَاهُ agnus lac sugens.

لَحْنَاهُ lac coagulatum.

لَحْنَاهُ lac molle.

لَحْنَاهُ وَلَحْنَاهُ argentum vivum.

لَحْنَاهُ وَلَحْنَاهُ limatura ferri. لَحْنَاهُ وَلَحْنَاهُ gummis

- arabica. سَجْنَةٌ وَأَقْهَنَةٌ وَمُهْمَّا سَجْنَةٌ et سَكْمَوْلًا irreptio, reptatio.
- balsamum. سَجْنَةٌ وَجَنْدَمَا سَجْنَةٌ mel purissimum.
- galion planta lac coagulans. سَجْنَةٌ galion planta lac coagulans.
- lacteus. سَجْنَةٌ lacteus.
- سَكْمَتٌ , fut. v. denom. سَكْمَتٌ mulxit; lac suxit, ar. حَلَبٌ . Ethpe. أَسْكَمَ pass. سَكْمَتٌ muletrum.
- سَخْنٌ , ar. خَنْبٌ , fut. سَخْنٌ falcula, adeps; membrana, cutis; dia phragma, et per ext. cor; it. velum.
- ad adipem pertimens, membranaceus. سَخْنَةٌ ad adipem pertimens, membranaceus.
- سَخْنَةٌ et سَخْنَةٌ γαλβάνη, galbanum, styrax.
- سَخْنٌ et سَخْنٌ spina.
- ornithogale planta ; vas, cucurbita excavata instar vasis (gall. calebasse). سَخْنٌ سَخْنٌ , fut. سَخْنٌ serpsit, irrepst; subiit.
- Ethpe. أَسْكَمَ pass.; introduc tus est.
- Pa. سَخْنٌ irrepst ut talpa.
- Aph. سَخْنٌ infixit.
- talpa, ar. تَلْفٌ . سَخْنٌ reptatio; merees imposita navibus; commixtio, in quisitio.
- سَخْنَةٌ et سَخْنَةٌ سَخْنَةٌ conchylium; limax marinus, ar. حَازِرُون . سَخْنَةٌ , v. sub سَخْنٌ .
- سَكْمَلٌ , fut. سَكْمَلٌ miscuit, immiscuit, conjunxit: se immiscuit, se adjunxit. Part. pass. سَكْمَلٌ سَكْمَلٌ commixtus, implicatus; adj. non genuinus, versicolor; - subst. in f. emph. سَكْمَلٌ cibus sorbilis ex tritico mixtus; cfr. ar. خَنْبٌ . Ethpe. سَكْمَلٌ pass. Pa. سَكْمَلٌ commisicut, conjunxit.
- Ethpe. سَكْمَلٌ pass. et refl. سَكْمَلٌ mixtura, humor; hordeum, zea; vestis variegata.
- سَكْمَلٌ mixtio.
- سَكْمَلٌ mixtura; turba confusa; pediculi, colluvies insectorum.
- et سَكْمَلٌ سَكْمَلٌ commixtio; communio; commercium; concubitus.
- سَكْمَلٌ promiscue.
- سَكْمَلٌ hordeum, zea.

مَكْتُومٌ mixtura, communio, conjunctio.

مَسْكُومٌ status rei mixtæ; commercium.

مَسْكُونٌ commixtor, digestor.

مَكْرُومٌ, fut. **مَسْلَلٌ** dulcis fuit, jucundus factus est. *Part.* *præs.* مَكْرُومٌ. *Part.* *præt.* مَكْرُومٌ, *subst.* mustum; *adj.* dulcis, suavis, *f. emph.* مَكْرُومٌ. *pl. m.* مَكْرُومٌ, *f.* مَكْرُومٌ. سَلَلٌ ظِنْتُمَا: سَلَتُمَا, مَكْرُومٌ odore suavis. جَوْسٌ مَلَلٌ aspec- tu jucundus. كَنْتَمَا filius dulcis: anethum fœni- culum.

Pa. مَكْ amarum in dulce con- vertit.

Ethpa. مَاسَكٌ dulcis factus est.

Aph. مَكَ ut *Pa.*

مَكْمَةٌ et مَكْمَةٌ cupedia, dulciaria, *ar.* خَازِنٌ.

مَهْكُومٌ mustum.

مَهْكُومٌ dulcedo; mustum, bellaria.

مَهْكُومٌ et مَهْكُومٌ jucunditas somni.

— *Pa.* مَهْكَلٌ lavit, abluit; purificavit.

Ethpa. مَهْكَلٌ *pass.*

Palp. مَهْكَلٌ dimovit e loco suo, agitavit, dissolvit. *Part.* مَهْكَلٌ perforatus, cavus.

Ethpalp. مَهْكَلٌ pass. præ- ced.

Aph. مَهْكَلٌ dissolvit; trop. profanavit sabbatum.

مَهْلَةٌ, cfr. heb. מִתְהֵלָה et ar. حِلَّ profanum; res licita; ca- verna.

مَهْكُمٌ habitator cavernarum.

مَهْكُمَةٌ, pl. مَهْكُمَاتٌ fovea; sepulcrum.

مَهْكُمَةٌ rima, fissura; caverna.

مَهْكُلٌ rima, excavatio; caver- na, crypta; via angusta in monte; cfr. خَلَقَ perforavit.

مَهْكُلٌ cavitas; dolabra.

مَهْكُلَةٌ rima.

مَهْكُلٌ, مَهْكُلَةٌ cavus; subst. cavi- tas; hypogaeum.

مَهْكُمَةٌ cavitas, locus subter- raneus.

مَهْكُمَةٌ, مَهْكُمَةٌ dies festus, con- vivium spec. nuptiale; thala- mus, nuptiae.

مَهْكُلٌ, مَهْكُلَةٌ detersio, lotura.

مَهْكَمٌ, vagina ensis; situla.

مَهْكُمَكٌ detergens.

مَهْكَمٌ pisa, id. q. ar. جَبَانٌ.

مَهْكُمَكَمٌ dissolutio.

مَهْكُمَكَمٌ dissolvens.

مَهْكَلٌ, مَهْكَلَةٌ, ar. خَلَقَ, acetum.

سُلْطَن pulvis, pulvisculus ; albugo ;
stola, cfr. ar. جَلْدٌ.

سُلْطَنَةٌ arena, heb. גַּתָּה.

سُلْطَنَةٌ arenosus.

سُلْطَنَةٌ , ar. خَالٌ , matruus.

سُلْطَنَةٌ matertera.

سُلْطَنَةٌ situla ; cfr. سُلْطَنَةٌ .

سُلْطَن , fut. سُكَّه somnia-

vit; cfr. حَلَمٌ somniavit, puber-

fuit. Part. act. سُلْطَنٌ ;

Part. pass. سُكَّهٌ , سُكَّهٌ ,

pl. سُكَّهٌ , سُكَّهٌ , f.

سُكَّهٌ ! سُكَّهٌ ; pl. سُكَّهٌ ;

adj. usurp. somnians, somniator;

sanus, salvus, validus ; trop.

orthodoxus ; سُكَّهٌ سُكَّهٌ vel سُكَّهٌ سُكَّهٌ valeas !

Ethpe. سُكَّهٌ sanatus est ; convaluit.

Pa. سُكَّهٌ sanavit.

Aph. سُكَّهٌ id.

Ethpalp. سُكَّهٌ somniavit ; pollutionem nocturnam passus est ; cfr. ar. اخْتَمَ .

سُكَّهٌ somnium, visio.

سُكَّهٌ ad somnia pertinens.

سُكَّهٌ somniator.

سُكَّهٌ سُكَّهٌ sanitas.

سُكَّهٌ سُكَّهٌ sanativus.

سُكَّهٌ سُكَّهٌ sane, recte, integre,

fortiter.

سُكَّهٌ سُكَّهٌ sanitas, integritas ;

fortitudo, pl. سُكَّهٌ .

سُكَّهٌ سُكَّهٌ mentis sanitas.

سُكَّهٌ سُكَّهٌ anchusa herba; papilla.

سُكَّهٌ سُكَّهٌ , f. emph.

سُكَّهٌ سُكَّهٌ sanitatem dans.

سُكَّهٌ سُكَّهٌ sanatio.

سُكَّهٌ سُكَّهٌ et سُكَّهٌ سُكَّهٌ chamae-

leon, id. q. heb. حَمَّار.

سُكَّهٌ سُكَّهٌ et سُكَّهٌ سُكَّهٌ stratum sub

clitellis, ephippium; tapetum,

ar. جَنْسٌ .

سُكَّهٌ سُكَّهٌ aristæ culmen.

سُكَّهٌ سُكَّهٌ , fut. سُكَّهٌ , ar. حَلَفٌ ,

mutavit, substituit : toton-

dit.

Pa. سُكَّهٌ mutavit, commutavit,

permutavit.

Ethpa. سُكَّهٌ pass. — alter-

natim egit, c. حَلَفٌ rei.

Aph. حَلَفٌ germinavit : suc-

cessit ; vices variavit. c. حَلَفٌ rei.

Schap. سُكَّهٌ سُكَّهٌ mutavit, con-

vertit, transformavit : cor-

rupit, adulteravit ; transluit.

Part. pass. مُسُكَّهٌ , مُسُكَّهٌ :

adj. varius, diversus.

Eschtafp. سُكَّهٌ سُكَّهٌ pass. et refl.

سُكَّهٌ سُكَّهٌ , vile كُفٌ .

سُكْرَا spoliatio, direptio.

سُكْرَةٌ strenue, fortiter.

سُكْرَةٌ direptio ; fortitudo, constantia.

سُكْرَا spoliatio ; præda.

سُكْلُوْهَا deprædatio.

سُكْلُوْنَا spoliator.

سُكْلُوْنَا deprædabilis.

سُكْلُوْنَا deprædatio, spoliatio.

سُكْمَرَا id. q. سُكْرَا .

سُكْمَهٍ , fut. سُكْمَهٍ divisit : decrevit, attribuit, instituit, cfr. ar. خَاقَ . Part. pass. سُكْمَهٍ , سُكْمَهٍ decretus, prædestinatus.

Ethpa. سُكْمَهٍ divisus est, dispersus est, evanuit.

سُكْمَةٌ portio, sors, fortuna ; pl. سُكْمَاتٌ fata, auguria.

سُكْمَاتٌ fatalista.

سُكْمَمٌ prædeterminatio ; fatum.

سُكْمَمٌ , سُكْمَمٌ debilis, abjectus, miser ; seq. سُكْمَمٌ cārens.

Pa. سُكْمَهٍ v. denom. debilitavit, humiliavit.

Ethpa. سُكْمَهٍ pass. ; debilis fuit.

سُكْمَهٍ tenuitas, debilitas, abjectio.

سُكَّا et سُكَّا specillum quo oculi inunguntur.

سُكَّا laserpitium, asa fœtida.

سُكَّا . fut. سُكَّا aruit, marcuit, languit : trop. defecit, evanuit : — it. verrit.

Pa. سُكَّا calefecit ; arefecit.

Aph. سُكَّا calefecit.

سُكَّا arefactio, extinctio ; purgatio scopis facta.

سُكَّا marcescere faciens, extinctor.

سُكَّا mareidus.

سُكَّا , سُكَّا socer, pl. سُكَّاتٌ .

c. aff. 1st p. سُكَّا ; c. al. pers.

سُكَّاهٌ , etc.

سُكَّاهٌ et سُكَّاهٌ id.

سُكَّاهٌ socrus.

سُكَّهٌ aposthema, pustula, uleus.

سُكَّهٌ arbor quædam infructuosa et umbrosa.

سُكَّهٌ et سُكَّهٌ planta ad murorum radicem pullulans.

سُكَّهٌ , fut. سُكَّهٌ portavit, coacervavit, recondidit, collegit ; trop. hospitio exceptit, ad sepulcrum deduxit ;

it. continuuit, cohibuit ; irruit,
impetum fecit, *ar.* حَمْلٌ .

Ethpe. سَعْدَةً pass.

Pa. سَعْدَةً collegit, cohibuit,
undique lacescivit *hostem*.

Ethpa. سَعْدَةً pass.

Aph. سَعْدَةً collegit.

سَعْدَةً , حَمْلًا asportatio, coa-
cervatio. حَمْلًا ۚ ۚ ۚ , pl. حَمْلًا ۚ ۚ ۚ thesaurus, apotheca.

سَعْدَةً part. pass. - subst. te-
gumentum, stratum, cooper-
torium : cfr. *ar.* خَيْرَةً .

Peal. fut. سَعْدٌ ar. حَمْلٌ incal-
luit ; trop. flagravit desiderio,
cupivit ; aruit, marcuit ; ver-
rit ; cfr. سَعْدٌ et *ar.* حَمْلٌ .

Ethpe. سَعْدَةً aestuavit.

Pa. سَعْدَةً calefecit, fovit.

Ethpe. سَعْدَةً pass. aestuavit ;
trop. ut *Peal*.

Aph. سَعْدَةً calefecit.

Palp. سَعْدَةً calefecit ; aruit.

Ethpalp. سَعْدَةً incaluit ;
emarcuit.

سَعْدَةً calor, aestus *febris*, solis,
etc.

سَعْدَةً scopæ.

سَعْدَةً et سَعْدَةً calor, aestus ;
calefactio.

سَعْدَةً , سَعْدَةً , f. emph. حَمْلًا
calidus, aestuans, ardens ;

subst. in m. foenum maturum ;
in f. emph. thermæ ; pl.
سَعْدَاتٍ .

سَعْدَةً ardenter.

سَعْدَةً aestus ; mundatio.

سَعْدَةً بِوْحَنْتَ mentis fervor.

سَعْدَةً amomum planta.

سَعْدَةً febris.

سَعْدَةً , f. , pl. سَعْدَاتٍ calor, aestus ; trop. furor, venenum,
aculeus *serpentis*, *ar.* حَمْلٌ .

Pa. سَعْدَةً v. denom. a *præc.*
ira, furore inflammavit ; -im-
pers. اِنْ لَدَهُ سَعْدَةً ira exarsit.

Ethpa. حَمْلًا iratus est ;
commotus est.

Aph. سَعْدَةً ira accedit, ex-
cerbavit.

سَعْدَةً سَعْدَةً iratus ; imp.
اِنْ سَعْدَةً iratus est.

سَعْدَةً , سَعْدَةً , f. emph. حَمْلًا
iracundus, irascibilis ; ferox.

سَعْدَةً سَعْدَةً iracunde.

سَعْدَةً سَعْدَةً irascibilis.

سَعْدَةً pultarius (*gall.* bouilloire).

سَعْدَةً سَعْدَةً sinus.

سَعْدَةً سَعْدَةً calorem producens.

سَعْدَةً سَعْدَةً incalescendi facultas.

سَعْدَةً سَعْدَةً irascibilitas.

سَعْدَةً — Pro inus. Pe. cfr.
ar. حَسْ fortis, strenuus fuit ;

inde c. epenthet. in forma seq.

سُقُونْ fortis factus est; *inde* perstitit, sustinuit, abstinuit *c. قُوَّةً*; perseveravit, patiens fuit; *c. vel s. أَبْرَأَ*, *et c. قَوْلَةً* pers. fortiter tenuit, confidit. سُقُونْ constantia; continentia. سُقُونْ constans, patiens. سُقُونْ constantia; patientia.

سُقُونْ , fut. سُقُونْ fermentatus est; *cfr. heb. בְּרִזֵּבֶת et ar. حُمْضٌ*.

Ethpe. سُقُونْ id.

Pa. سُقُونْ fermentavit.

Ethpa. سُقُونْ pass. ; trop. coccus est.

Aph. سُقُونْ fermentare fecit, fermentavit.

سُقُونْ fermentatio; *it. ut seq.*

سُقُونْ grana mali granati.

سُقُونْ et سُقُونْ oxalis plan-
ta, rumex; *pl. سُقُونْ (gall.
oseille)*; *cfr. ar. حُمَاضٌ*.

سُقُونْ , سُقُونْ fermentatus;
subst. fermentatus panis.

سُقُونْ fermentatio.

سُقُونْ , fut. سُقُونْ acidus fac-
tus est, acuit; *cfr. ar. حُمْضٌ*.

*Pa. سُقُونْ ruborem intulit, pu-
dore afficit.*

Ethpa. سُقُونْ erubuit.

*Aph. سُقُونْ acidum reddidit;
pudorem alicui injecit.*

سُقُونْ cicir, *pl. سُقُونْ; ar. حُمْضٌ*;
*it. lomentum seu farina ex fa-
bis confecta.*

سُقُونْ acidus, acer.

سُقُونْ et سُقُونْ rheum planta.
سُقُونْ et سُقُونْ aciditas;
ar. حُمُوضَةٌ.

سُقُونْ يَانِمٌ , سُقُونْ verecundus.
سُقُونْ سُقُونْ pudor, verecun-
dia.

سُقُونْ et سُقُونْ id.

سُقُونْ pudibundus.

سُقُونْ colchicum autumnale.

سُقُونْ , fermentavit; *cfr. ar.*

سُقُونْ , سُقُونْ - خَمْرٌ .
subst. fermentum, *ar. خَبْرٌ*.
سُقُونْ , ar. pl. سُقُونْ , سُقُونْ vinum; *trop. succus.*
سُقُونْ وَحْمًا oxymel seu potus
melle vinoque paratus. سُقُونْ مَلَوْمَةً mel rosatum.
mustum.

سُقُونْ سُقُونْ , سُقُونْ vineus, ad vinum
spectans.

سُقُونْ dimin. سُقُونْ .

سُقُونْ سُقُونْ , ar. سُقُونْ .
خَمَارٌ .

سُقُونْ سُقُونْ , *f. مَسْقُونْ* vinolentus.

سَعْدَةٌ سَعْدَةٌ et سَعْدَةٌ c., pl. سَعْدَةٌ et سَعْدَةٌ , asinus ; cfr. ar. حِمَار ; metaph. fidium ponticulus (gall. chevalet d'instrument à cordes). سَعْدَةٌ بَبُونٌ rhinoceros. سَعْدَةٌ وَتَنٌ onager. سَعْدَةٌ اسِنَا asina.

سَعْدَةٌ اسِلُّوسٌ asellus. سَعْدَةٌ اسِنَارِيُّوسٌ asinarius. سَعْدَةٌ et سَعْدَةٌ دُوكُورٌ ductor asinorum *vel* camelorum.

سَعْدَةٌ مُهَمَّةٌ سَعْدَةٌ مُهَمَّةٌ asinorum commercium.

سَعْدَةٌ وَرَأْسَهُ , *vide* سَعْدَةٌ . سَعْدَةٌ , f. emph. سَعْدَةٌ et سَعْدَةٌ , f. emph. سَعْدَةٌ et سَعْدَةٌ لَبَّوْنٌ globulus, lapillus, gemma ; it. spec. *in emph.* vertebra, basis columnæ, series lapidum ; *in pl.* millepedæ ; conchæ seu vitræ spherulæ collo appenduae monilis instar ; catenæ. سَعْدَةٌ مُهَمَّةٌ لَحْنَةٌ lapides pretiosi. سَعْدَةٌ مُهَمَّةٌ مَنْجَنٌ solanum nigrum.

٧٤
سَعْدَةٌ , st. absol. c. fem. nom. usurp. ar. حَمْسٌ , emph. سَعْدَةٌ c. masc. usurp., f. emph. سَعْدَةٌ quinque ; c. aff. سَعْدَةٌ nos quinque, etc. سَعْدَةٌ , vel سَعْدَةٌ وَسَعْدَةٌ dies quintus ; dies Jovis. سَعْدَةٌ feriâ

quintâ. سَعْدَةٌ حَسْنَةٌ dies quinta mensis. سَعْدَةٌ quin-tus.

سَعْدَةٌ حَسْنَةٌ vel سَعْدَةٌ حَسْنَةٌ m., f., quindecim. سَعْدَةٌ حَسْنَةٌ decimus quintus. سَعْدَةٌ حَسْنَةٌ ؛ سَعْدَةٌ annus decimus quintus aetatis.

سَعْدَةٌ quinquaginta. سَعْدَةٌ et سَعْدَةٌ Pentecos-tes.

سَعْدَةٌ quinginti. Pa. سَعْدَةٌ v. denom. quintam partem cepit (ar. حَمْسَةَ الْمَالِ) .

سَعْدَةٌ quinta pars, ar. حَمْسٌ ; it. abdomen, heb. חַבֵּשׁ . سَعْدَةٌ , f. سَعْدَةٌ quintus, quinque litteris constans.

سَعْدَةٌ مُهَمَّةٌ quintupliciter. سَعْدَةٌ مُهَمَّةٌ quintitas.

سَعْدَةٌ , سَعْدَةٌ et سَعْدَةٌ , v. سَعْدَةٌ .

سَعْدَةٌ , fut. سَعْدَةٌ , flexit, inclinavit ; finem intendit, scopum attigit, absolute *vel* seq. objecto c. ﴿ , ﴾ *vel* سَعْدَةٌ ; it. cum fine congruit ; trop. spectavit, animadvertisit ; cfr. heb. חַנָּה et ar. حَقٌّ . Part. act. سَعْدَةٌ , intentus, consentaneus ; elegans.

Ethpe. سَعْدَةٌ inclinatus est.

سْتَمْ inclinatio, directio, intentione; opinio.

سْتَمَّ conjecturaliter.

سْتَفَّا , pl. سْتَفَّا , سْتَفَّه , fornix, cella, taberna, officina; lupanar; cfr. ar. حَان , حَانُوت وَحَيَّة .

سْتَفَّا et سْتَفَّا , f. سْتَفَّه مَا tabernarius, caupo.

سْتَفَّا et سْتَفَّا , v. s. سْتَفَّ .

سْتَهَلْكَه , fut. سْتَهَلْكَه doluit, cfr. سْتَهَلْكَه et سْتَهَلْكَه ; سْتَهَلْكَه dolore affectus est.

Pa. سْتَهَلْكَه suspirare fecit.

Ethpa. سْتَهَلْكَه ingemuit, suspiria duxit.

Aph. سْتَهَلْكَه suspirare, gemere fecit.

سْتَهَلْكَه , pl. سْتَهَلْكَه suspirium, gemitus.

سْتَهَلْكَه , سْتَهَلْكَه gemens; flebilis, lamentabilis; impers. سْتَهَلْكَه مَنْ لَهْلَهْ gemebat. مَنْ سْتَهَلْكَه quam tristis est ista res ! مَهْلَهْ سْتَهَلْكَه verba flebilia.

سْتَهَلْكَه gemebunde, amare.

سْتَهَلْكَه suspirium. مَهْلَهْ سْتَهَلْكَه gemebunde.

سْتَهَلْكَه , fut. سْتَهَلْكَه aromatibus condivit mortuum.

Ethpe. سْتَهَلْكَه pass.

Pa. سْتَهَلْكَه id. ac Pe.

Ethpa. سْتَهَلْكَه pass.

سْتَهَلْكَه mixtura aromatica, unguenta ad condiendos mortuos.

سْتَهَلْكَه qui condit mortuos.

سْتَهَلْكَه actus conendi mortuos.

سْتَهَلْكَه et c. contr. سْتَهَلْكَه tritum, pl. سْتَهَلْكَه , ar. سَبَقْ .

سْتَهَلْكَه et c. contr. سْتَهَلْكَه f. palatum; cfr. supra سْتَهَلْكَه , ar. حَنَك . et heb. حَنَك . مَهْلَهْ سْتَهَلْكَه amarus palato: querulus, tristis.

سْتَهَلْكَه id.

سْتَهَلْكَه , fut. سْتَهَلْكَه misertus fuit, propitius, elemens fuit.

Part. präs. سْتَهَلْكَه . Part. pass. سْتَهَلْكَه cui propitiatum est.

Ethpe. سْتَهَلْكَه gratiam. misericordiam obtinuit, veniam consecutus est, c. سْتَهَلْكَه pers.

Ethpa. سْتَهَلْكَه gratiam petiit, veniam supplicavit; it. ut Ethpe.

سْتَهَلْكَه miseratio, misericordia, gratia; pulvis benedictus ex reliquiis martyrum ad infirmos curandos adhibitus.

سْتَهَلْكَه gratia.

سْتَهَلْكَه , سْتَهَلْكَه clemens, misericors.

رَانْسِدُسٌ **رَانْسِدُسٌ** rancidus; cfr. heb.
הַנְּזָרֶת foetor.

رَانْسِدُمٌ **رَانْسِدُمٌ** oleum rancidum.

رَانْسِتَنْسٌ مَدْحُومٌ **رَانْسِتَنْسٌ مَدْحُومٌ** gratia, miseratione dignus, miser.

رَانْسِتَنْسٌ مَهْلِكٌ **رَانْسِتَنْسٌ مَهْلِكٌ** humilis precatio.

رَانْسِتَنْسٌ مَهْلِكٌ **رَانْسِتَنْسٌ مَهْلِكٌ** suppliciter.

رَانْسِتَنْسٌ مَهْلِكٌ **رَانْسِتَنْسٌ مَهْلِكٌ** supplicatio.

رَانْسِتَنْسٌ مَهْلِكٌ **رَانْسِتَنْسٌ مَهْلِكٌ** vulva.

رَانْسٌ مَهْلِكٌ **رَانْسٌ مَهْلِكٌ** sinus; pudenda; cfr. ar. حَضْنٌ, et heb. חַצֵּן.

رَانْسٌ مَهْلِكٌ **رَانْسٌ مَهْلِكٌ** pron. 1^o pers. pl. nos, v. بَنِي.

رَانْسٌ مَهْلِكٌ **رَانْسٌ مَهْلِكٌ**, f. impius, apostata; ethnicus; cfr. ar. حَنِيفٌ et heb. חֲנִינָה profanus, impius.

Pa. رَانْسٌ **رَانْسٌ** v. denom. ethnium, apostatam reddidit.

Ethpa. رَانْسٌ **رَانْسٌ** paganismo nomen dedit; profanus, impius factus est.

Aph. رَانْسٌ **رَانْسٌ** apostata factus est.

إِنْسَفَمٌ **إِنْسَفَمٌ** impietas, apostasia; Sabeismus; cultus impius, ethnicismus, idololatria; coll. Ethnici.

إِنْسَفَمٌ **إِنْسَفَمٌ** ethnicorum more.

إِنْسَفَمٌ **إِنْسَفَمٌ** ethnicus.

إِنْسَفَمٌ سَلَوْنٌ **إِنْسَفَمٌ سَلَوْنٌ** porculus, ar. خَنْوَصٌ et سَلَوْنٌ porculus, ar. سَلَوْنٌ.

إِنْسَفَمٌ **إِنْسَفَمٌ**, fut. سَلَوْنٌ, ar. خَنْقٌ strangulavit, suffocavit; angustiavit, eruciat. Part.

act. سَلَفٌ وَادْخَلَ **سَلَفٌ وَادْخَلَ** et سَلَفٌ نَعْدَهَا **سَلَفٌ نَعْدَهَا** aconitum planta.

Ethpe. إِنْسَفَمٌ **إِنْسَفَمٌ** pass.

Pa. سَلَفٌ strangulavit, suffocavit, submersit.

Ethpa. إِنْسَفَمٌ **إِنْسَفَمٌ** pass.

إِنْسَفَمٌ strangulatio, suffocatio; angustiae; c. suff. 1^o pers. سَلَفَهُ, 3^o pers. سَلَفَهُ, 3^o pl. سَلَفَهُمْ.

إِنْسَفَمٌ suffocatio, cruciatus; laqueus, vineulum; in plur. tæniae. حُمَّهُ سَلَفَهُمْ pl. حُمَّهُ سَلَفَهُمْ terminus.

إِنْسَفَمٌ strangulans, suffocans. — subst. angina; cfr. ar. حَلْقَةٌ.

إِنْسَفَمٌ **إِنْسَفَمٌ** locus angustus.

إِنْسَفَمٌ strangulatio, immersio. إِنْسَفَمٌ strangulatio, laqueus; angustiae.

إِنْسَفَمٌ **إِنْسَفَمٌ**, part. pass. adj. usurp. f. emph. إِنْسَفَمٌ; pl. m. abs. سَلَفَهُ, emph. سَلَفَهُ, st. c. سَلَفَهُ, f. abs. سَلَفَهُ, emph. إِنْسَفَمٌ mundus, purus, sanctus, venerandus; c. aff. سَلَفَهُ sanctus meus, c. al. pers. سَلَفَهُ, سَلَفَهُ, سَلَفَهُ, etc.; سَلَفَهُ vel سَلَفَهُ sancti mei, سَلَفَهُ vel سَلَفَهُ sancti ejus, etc. — subst. titulus honoris adhibitus pro

Episcopis, Abbatibus, etc.

Pa. **פָּרַשׁ** purificavit, absolvit, sanctificavit, consecravit; veniam præstitit, condonavit; expiavit, *c.* **לְקָדֵשׁ**; propitium reddidit. *Part. act.* **מִשְׁפְּט**, **מִשְׁפְּטָן** propitians, propitiorius. *Part. pass.* **מִשְׁפְּטָן** justificatus; *adj.* innocens, *pl.* **מִשְׁפְּטָן**, **מִשְׁפְּטָן**.

Ethpa. **בְּמִשְׁפְּטָן** *pass.*; veniam, absolutionem accepit; innocens, immunis fuit.

מִשְׁפְּטָה sancte, pure.

מִשְׁפְּטָה, *st. const.* **לִשְׁפְּטָה**, innocentia, sanctitas; *it.* dignitas episcopalis, episcopatus.

יְלִשְׁפְּטָה Sanctitas Vestra.

מִשְׁפְּטָה, **מִשְׁפְּטָה** misericordia, propitiatio, condonatio; oratio propitiatoria; propitiatorium *seu* ephod; operculum arcæ foederis.

מִשְׁפְּטָה propitiator; propitiatus.

מִשְׁפְּטָה more propitiatoris.

מִשְׁפְּטָה piabilis, remissibilis *culpa*.

מִשְׁפְּטָה, *fut.* **מִשְׁפְּטָה** *vix in usu;* *cfr. heb.* יְכֹנֵן probro afficit, *et ar.* יְכֹנֵן, invidus fuit. *Part. pass.* **מִשְׁפְּטָה**, *f.* **מִשְׁפְּטָה**, invidiæ objectum; gratia plenus.

Pa. **מִשְׁפְּטָה** contempsit, exprobavit, maledixit. **מִשְׁפְּטָה** **חַמְמָא** animam suam usque ad mortem contempsit, *i. e.* se morti devovit.

Ethpa. **בְּמִשְׁפְּטָה** *pass.*

מִשְׁפְּטָה probrum, ignominia; gratia, misericordia.

מִשְׁפְּטָה amabilitas.

מִשְׁפְּטָה invidens.

מִשְׁפְּטָה opprobrium, maledictio.

מִשְׁפְּטָה convitiis afficiens, contumeliosus.

מִשְׁפְּטָה **לְמִשְׁפְּטָה** cum dedecore, turpiter.

מִשְׁפְּטָה **לְמִשְׁפְּטָה** dedecore dignus.

מִשְׁפְּטָה cartilago.

מִשְׁפְּטָה cartilagineus.

מִשְׁפְּטָה, *fut.* **מִשְׁפְּטָה** cohibuit, prohibuit; pepercit, salvavit, liberavit; retinuit, seposuit; *c.* **לְמִשְׁפְּטָה** denegavit; *trop.* **לְמִשְׁפְּטָה** tempori tuo pepercit.

Part. pass. **מִשְׁפְּטָה**, **לִשְׁפְּטָה** abstiens, immunis; *subst.* locus tectus, munitus.

Ethpe. **בְּמִשְׁפְּטָה** cohitus est, servatus est, immunis fuit.

Pa. **מִשְׁפְּטָה** retinuit, seposuit.

Ethpa. **בְּמִשְׁפְּטָה** immunis fuit.

מִשְׁפְּטָה **מִשְׁפְּטָה** cohhibitio, privatio.

מִשְׁפְּטָה **מִשְׁפְּטָה** abstinentia; solitudo.

سُهْ cohibens.

سُهْ prohibito, immunitas.

سُهْ et سُهْ ut سُهْ .

سُهْ et سُهْ parcus, avarus.

سُهْ et سُهْ avaritia; cohibitio, impedimentum.

سُهْ id. q. سُهْ .

سُهْ avarus, parcus.

سُهْ parcimonia.

سُهْ artifex inaurium.

سُهْ , fut. سُهْ ablactavit; trop. cohibuit, abduxit. سُهْ مُنْ se a te separat. سُهْ a voluptatibus ablactati.

Ethpe. سُهْ pass. et refl.

سُهْ ablactatio.

سُهْ ablactatio; abstinentia.

سُهْ , fut. سُهْ et سُهْ invidit, invidus fuit c. د rei, æmulatus est. Part. pass. سُهْ , سُهْ invidens, inde adj. egregius, excellens. سُهْ حَمْدَه سُهْ لِ nolite zelare mortem, seu nolite ultro mortem accersere operibus peccati.

Ethpe. سُهْ invidiae, odio fuit.

Pa. سُهْ desideravit.

Ethpe. سُهْ لِ zelotypia correp-tus est; invidiam passus est.

سُهْ zelus, invidia. سُهْ بِلْ sine invidia; liberaliter.

سُهْ سُهْ invide.

سُهْ et سُهْ سُهْ invidus.

سُهْ invidus, æmulator.

سُهْ invidia; æmulatio. سُهْ بِلْ سُهْ liberalitas.

سُهْ سُهْ invidiae objectum.

سُهْ , fut. سُهْ fortis, vali-dus fuit, convaluit; difficilis fuit; dolorem partus passa est; graviter ægrotavit; it. in forma trans. سُهْ , fut. سُهْ prævaluuit, vicit, oppressit. Part. pass. سُهْ , سُهْ vici-tus.

Ethpe. سُهْ لِ pass. victus est.

Pa. سُهْ munivit, custodivit; confirmavit.

Ethpa. سُهْ لِ pass. ; it. fortis factus est, prævaluuit, se mu-nivit.

Aph. سُهْ roboravit, munivit, custodivit.

سُهْ , pl. سُهْ et سُهْ cas-tellum, arx; حَمْدَه سُهْ id.; efr. ar. حَضْن .

سُهْ munitio, defensio; ro-bur.

سَعْيٌ *dim. prae.*

سَعْيٌ , *v. s.* سَعْيٌ .

سَعْيٌ *castellanus, areem occu-*
pans.

سَعْيٌ , سَعْيٌ *validus, fortis,*
potens, vehemens; difficilis.

سَعْيٌ *fortiter, valide.*

سَعْيٌ *munimentum.*

سَعْيٌ *munitio.*

سَعْيٌ *part. Aph., adverb.*
usurp. c. præp. سَعْيٌ
parum quin, vix, ægre. مُنْ
سَعْيٌ et مُنْسَقٌ *id.*

سَعْيٌ *lumbi; inguen, pudenda.*

سَعْيٌ *vincibilis.*

سَعْيٌ *clades.*

سَعْيٌ , f. سَعْيٌ , pl. سَعْيٌ ,

lactuca; *cfr. ar.* سَعْيٌ .

سَعْيٌ *anchusa.* سَعْيٌ *lactu-*

ca sylvestris.

سَعْيٌ , *fut. سَعْيٌ , ar.* خَرَسٌ, defec-
it, imminutus est; eguit,
damnum sustinuit, amisit;
expendit, mulctam subiit.

Pa. سَعْيٌ *deficere fecit, detri-*
mento affecit, mulctavit.

Ethpa. سَعْيٌ *pass.*

Aph. سَعْيٌ *perdidit, amisit;*
damno affecit, deficere fecit;

c. مُنْ *fraudavit; mulctavit.*

Ettaph. سَعْيٌ *muleta dam-*
natus est.

سَعْيٌ *defectus, damnum, jac-*
tura, egestas; mulcta, im-
pensæ. مُتَلِّا وَسَعْيٌ *verba*
injuriosa.

سَعْيٌ , سَعْيٌ *indigen, c. vel s.*

سَعْيٌ *rei; deficiens, quod deest;*
in st. c. cum alio nom. desti-
tutus, carens; كَسَعْيٌ *mili*
deest. لَوْلَى سَعْيٌ deerat, reli-
quum erat. بِسَعْيٌ *inopes; subst. in pl. f.* requisita,
necessaria. حَدَّادًا وَسَعْيٌ *li-*

*ber Paralipomenon. بِسَعْيٌ *stultus.**

سَعْيٌ *destitutus fide: adv.* مَنْ سَعْيٌ *plus minus.* مَنْ سَعْيٌ *parum*

abest quin, fere. لَا تَفْعَلْتَ مَنْ سَعْيٌ *nee detrimen-*

تُونْ سَعْيٌ *nee augmentum accepit.*

سَعْيٌ , لَوْلَى سَعْيٌ *defectus, im-*

minutio, inopia; id quod de-
est. لَوْلَى سَعْيٌ *incredulitas.*

سَعْيٌ , f. سَعْيٌ سَعْيٌ , pl. f.

سَعْيٌ *damnosus, nocens.*

سَعْيٌ et سَعْيٌ , *fut. سَعْيٌ*
textit, operuit, abscondit; *cfr.*
ar. حَفَّ .

Ethpe. سَعْيٌ *pass.*

Pa. سَعْيٌ *ut Pe.; trop.* ad
silentium coegit; rem preter-
misit; omisit, seq.. حَفَّ .

<i>Part. act.</i> مَسْفِرًا , مَسْفِرًا , pl. حَلَّا مُكْتَبٌ مَسْفِرًا يُوَدِّا ; مَسْفِرٌ Deus ineffabilis est. <i>Part. pass.</i> مَسْفِرًا , مَسْفِرًا , f. emph. مَسْفِرًا , مَسْفِرًا , pl. m. مَسْفِرٌ , مَسْفِرٌ , f. مَسْفِرٌ مَسْفِرًا ; adj. secretus, occultus.	سَخْنَمًا pedum nuditas.
<i>Ethpa.</i> اسْفَلٌ , pass.; se abdidit; opertus, obrutus est ; trop. erubuit ; gram. occultata est littera; sustentata est planta.	
سَعْدًا et سَعْدًا absconsio.	
سَعْدَةً secreto.	
سَعْدًا , سَعْدًا tectio, absconsio ; eclipsis lunæ ; ap. gram. litteræ occultatio ; sudis.	
سَعْدَتْ culices.	
سَعْدَةً clam ; submissa voce.	
سَعْدَةً occultatio.	
سَعْدَةً qui tegit.	
سَعْدَةً occultationem patiens littera.	
سَعْدَةً absconsio.	
سَعْدَةً , pl. سَعْدَتْ velatio, tegumentum, velamen ; it. cortex, discaleatio.	
سَعْدَتْ , it. سَعْدَتْ , ar. حَقِيَّ , discaleatus ; adverb. in form. سَعْدَتْ ; سَعْدَتْ nudis pedibus incessit.	
سَعْدَةً discaleate.	
سَعْدَةً discaleatio.	
سَعْدَةً nudipes.	
سَعْدَةً - cfr. heb. שְׁנָן animum applicuit, et ar. حَفَظَ servavit. et حَفَظَ zelus, ira justa.	
Pa. سَعْدَه incitavit, adhortatus est ; suggestit, ursit. <i>Part. act.</i> مَسْفِرٌ , urgens. <i>Part. pass.</i> مَسْفِرٌ ; adj. assiduus.	
Ethpa. اسْفَلٌ studuit, operam navavit, diligenter egit.	
اسْفَلٌ هَذِهِ مَذْنَبٌ هَذِهِ مَهْمَنَةً diligenter abjecit a se pondus omne divitiarum.	
سَعْدٌ studiosus, assiduus, curam habens, instans ; f. سَعْدَه pl. m. سَعْدَه , سَعْدَه , f. سَعْدَه .	
سَعْدَه studiose, sollicite.	
سَعْدَه , سَعْدَه studium, sollicitudo, diligentia, incitatio; solemnitas; -adverb. دَحْلَه	
سَعْدَه summo studio.	
سَعْدَه adhortatio, sollicitudo, incitatio.	
سَعْدَه exactor, incitator.	
سَعْدَه diligenter, accurate.	
سَعْدَه et سَعْدَه incitatio.	
سَعْدَه incitandus.	
سَعْدَه f. , pl. سَعْدَتْ , manipulus, pugillus, ar. حَنْتَه ; it. palma manus.	

سق, fut. سق v. denom.
duabus manibus cepit.
مسقنا obstetrix.

مسق, fut. سق fricuit,
detersit; cfr. سق.

Ethpe. امسق pass.

Aph. امسق oppressit; fastuose
incessit.

مسقا et مسقا frictio, smegma,
quidquid ad detergendum in-
servit.

مسقا ramus palmæ.

مسقا rumex; althæa (gall.
guimauve).

مسقا id.

مسقا ulceris species; furfu-
res; it. vestis duplicata pro
حمسقا.

مسق, fut. سق; fudit;
cuniculos egit, ar. حفر; id. c.
fut. سق erubuit, ar. حفر.

Part. pass. سق, سق;
subst., fossa, sepulchrum.

Ethpe. امسق effossus est.

Pa. سق pudorem ineuissit,
ignominia affecit.

Ethpa. امسق ut Ethpe.

Aph. امسق erubuit præ pudore.

مسقا effossio, fovea.
مسقا سقا, سقا fovea, canalis;
sepulchrum, fodina; pudor,

confusio. هلا سق mortem
obiit.

مسقا et سقا pudor, pudefac-
tio; fossio.

مسقا effosso; pudefactus.

مسقا pudore afficiens.

مسقا id quod effoditur; inde
metalla.

مسقا, fut. سقا, effudit,
eruit, evulsit; cfr. heb. חזה
divisit, et ar. حصى castravit.

Ethpe. امسق pass.

Pa. سقا eruit oculum; reseca-
vit.

مسقا actus crucandi.

مسقا eruens; dentiscalpium.

مسقا auriscalpium (gall.
cure-orcille).

مسقا f., securis parva.

مسقا instrumentum quo quid
eruitur.

مسقا سقا, سقا, lumbus; dorsum: trop. su-
perficies; مسقا terga ver-
tit. سقا aufugit; cfr. chald. חרבא et heb. חרבא.

مسقا سقا, سقا vas sigillum;
urceus, dolium; cfr. سقا,
حربا et assyr. hasbu.

مسقا سقا, fut. سقا messuit.

Ethpe. سَرْسُورٌ pass.

سَرْسُورٌ messis.

سَرْسُورٌ messor ; it. falx messorius.

سَرْسُورٌ actus seu ars metendi.

سَرْسُورٌ - *inus in Pe.*

Pa. سَرْفٌ impudens fuit, audax fuit ; impugnavit, instituit.

Ethpa. سَرْفٌ impudens factus est, procaciter egit.

Aph. سَرْفٌ procacem reddidit ; it. audacter ursit, instituit, procax fuit, ausus est. سَرْفٌ

أَفْتَنْ pudorem abjecit *mulier* ; سَرْفٌ audacter dixit.

سَرْفٌ audacia, impudentia ; pertinacia.

سَرْفٌ testa figulina, ar. خَرْفٌ ; cf. سَرْخَا.

سَرْفٌ et سَرْفَتْنَا سَرْفَتْنَا pl. m. سَرْفَتْنَا f. سَرْفَتْنَا testaceus.

سَرْفِخَا impudens, arrogans.

سَرْفِخَامَهَا impudenter.

سَرْفِخَامَهَا audacia, impudentia, petulantia, importunitas.

سَرْسُورٌ et سَرْسُورٌ pl. سَرْسُورٌ pl.

سَرْسُورٌ calculus, lapillus ; cf. ar. حَصَّا.

سَرْسُورٌ , ar. خَصَّرٌ digitus auricularis, *inde metaph.* parvum

quid; it. calamus scriptorius.

سَرْفَةٌ وَمَسْتَانْدَلٌ annulus. دَنْدَلٌ سَرْفَةٌ guttula aquæ.

سَرْفَةٌ septum ; cfr. ar. حَصَرٌ circumdedit. سَرْفَةٌ قَبْرًا reticulum jecoris.

سَرْفَةٌ مَهْلَكٌ , fut. سَرْفَهُ مَهْلَكٌ prosiluit.

سَرْفَةٌ سَلْطَنٌ saltus.

سَرْفَةٌ مَهْلَكٌ , fut. سَرْفَهُ مَهْلَكٌ insiluit.

Pa. سَرْفَهُ assilire fecit.

سَرْفَةٌ سَلْطَنٌ saltatio, assultus.

سَرْفَهُ مَهْلَكٌ f. , pl. سَرْفَهُ مَهْلَكٌ et سَرْفَهُ مَهْلَكٌ

ager, campus, prædium. cfr.

ar. et حَقْلٌ ; سَرْفَهُ مَهْلَكٌ ; سَرْفَهُ مَهْلَكٌ

ager Deo consecratus ; سَرْفَهُ مَهْلَكٌ وَأَحْمَدَهُ

ager emptus.

سَرْفَهُ , heb. סְרִבָּה , ar. حَقَّ , veritas.

سَرْفَهُ مَهْلَكٌ , fut. سَرْفَهُ مَهْلَكٌ gloriatus est, se jactavit.

Ethpe. سَرْسُورٌ id.

سَرْفَهُ jactantia ; adulatio.

سَرْفَهُ مَهْلَكٌ , fut. سَرْفَهُ مَهْلَكٌ alvum purgavit, ar. خَرَئٌ .

سَرْفَهُ ، coxa, femur, pl. سَرْفَهُ podex ; it. excrementum.

سَرْفَهُ , pl. سَرْفَهُ , st. c. سَرْفَهُ , stereus ; سَرْفَهُ قَنْدَلٌ scoriae

ferri. حَمَّةٌ سَنْمًا et حَمَّةٌ مَسْنَمًا latrina.

لَوْسَنْت, v. s. سُنْفَة.

| سُنْفَة - Ethpe. سَنْفَل, cfr. heb. חַרְבָּה, altercatus est, rixatus est, litem movit, contendit, restitit, hæsit; nisus est.

Eschtaiph. سَنْفَل, v. s. سَنْفَل.

Aph. سَنْفَل paravit arma.

سُنْفَل, سُنْمًا contentio, litigatio; controversia, dissidium. وَلَمْ كَسْنَمًا سَنْمًا sine dubio. كَسْنَمًا contentiosus.

سُنْمًا id. q. سَنْمًا, v. s. سَنْفَل.

سُنْمَلَه contentiose.

سُنْمَلَه contentiosus; polemicus.

سُنْمَلَه id.; pl. سُنْمَلَه, et سُنْمَلَه, et سُنْمَلَه; haeretici.

سُنْمَلَه litigatio, lis.

سُنْمَلَه res cui contradicitur; حَمَّةٌ مَسْنَمًا حَمَّةٌ مَسْنَمًا signum contradictionis; it. rixosus.

سُنْمَلَه, fut. سَنْفَل, cfr. حَرَبَه et

حَرَبَه, vastatus est, desertus est, destructus est, corruuit; exsiccatus est fluvius; trans.

سُنْمَلَه, fut. ar. حَرَبَه, vastatus est, destruxit, occidit; bellavit. Part. pass.

سُنْمَلَه desertus; gladio trucidatus.

Ethpe. سَنْفَل et Ethpa. سَنْفَل pass. vastatus est; profligatus est.

Aph. سَنْفَل vastavit, destruxit; perdidit; exhausit, exsiccavit aquas.

سُنْفَدَه, heb. حَرَبَه, ar. حَرَبَه, desertum; vastatio, desolatio; it. f. otis, ar. حَرَبَه, (gall. outarde); adj. desertus; trop. vanus.

سُنْفَدَه, f. emph. سَنْفَدَه, pl. سَنْفَدَه vastatus, desertus; c. مَهْدَه destitutus; subst. spec. in f. emph. desertum, solitudo, ruina, excidium.

سَنْفَل c. gladius, ar. حَرَبَه, trop. bellum, eædes, vastatio; cfr. ar. سَنْفَل - حَرَبَه, حَرَبَه, وَقْبَلَه vomer aratri.

سُنْفَدَه et سُنْفَدَه desolatio.

سُنْفَدَه desertus. سُنْفَدَه desolatio, solitudo.

سُنْفَدَه vastator.

سُنْفَدَه vastatio, excidium.

سُنْفَل, سُنْفَل destructus, de-

sertus.

سُنْفَدَه et سُنْفَدَه desolatio,

eversio.

سُنْفَدَه devastator.

سُنْفَدَه ar. حَرَبَه, siliqua; la-

brusæ.

سَهْوَةٌ , ar. خَرَبَقْ , hellebo-
rus.

سَهْبُمَا asinorum ductor, pers.
خَرَبَنَهْ , asinarius servus.

سَهْفُمَا cassia arbor.

سَهْفَمَهْ et سَهْفَمَهْ ansa chla-
mydis, manubrium.

سَهْفَهْ , fut. سَهْهْ fricuit ;
detersit, polivit. Part. pass.
سَهْهْ ; adj. elegans ; subst.
carthamus tinctorius.

Ethpe. سَهْلَلِ pass. et refl.
lex.

Pa. سَهْلَلِ valde fricuit.

Ethpa. سَهْلَلِ pass.

سَهْلَهْ frictio, detersio.

سَهْلَهْ ephippium, sella.

سَهْلَهْ subflavus, cfr. سَهْلَهْ .

سَهْلَهْ politura ; nitor.

سَهْلَهْ et سَهْلَهْ locusta.

سَهْلَهْ , cfr. heb. חַדְרָה .

Ethpe. سَهْلَهْ timuit, tremuit.

Ethpa. سَهْلَهْ frictus est.

سَهْلَهْ , ar. خَرْدَلْ , sinapis.

سَهْلَهْ sinapis agrestis alba.

سَهْلَهْ mucus narium.

سَهْلَهْ lacerta, ar. جَرْذَنْ ;

سَهْلَهْ et سَهْلَهْ وَهْهَا crocodilus. id.;

سَهْلَهْ وَهْهَا scincus.

سَهْلَهْ et سَهْلَهْ titillatio.

سَهْلَهْ , fut. سَهْلَهْ contexuit,
ordinavit, inseruit, dispositus ;
سَهْلَهْ sermonem suum
eleganter contexuit. Part.
pass. سَهْلَهْ ; subst. filum
margaritarum; cfr. ar. خَرْزَ .
Ethpe. سَهْلَهْ trajectus, perfora-
tus est ; it. insertus est, dis-
positus est.

سَهْلَهْ et سَهْلَهْ dispositio, contex-
tio.

سَهْلَهْ amuletum, ar. جَرْزَ .

سَهْلَهْ ordinatio, dispositio.

سَهْلَهْ latratus canis, ejusdem
caudae motitatio.

سَهْلَهْ incisus, cœlatus, lima-
tus.

سَهْلَهْ dolatio, limatio.

سَهْلَهْ blanditiis dolo mixtis
usus est.

سَهْلَهْ caudam motitavit canis ;
it. hirravit, ululavit.

سَهْلَهْ ululatus canum.

سَهْلَهْ , fut. سَهْلَهْ scalpsit, la-
ceravit ; cfr. ar. خَرْطَ .

Ethpe. سَهْلَهْ pass. et refl.

Pa. سَهْلَهْ fortiter, saepius seal-
psit.

Ethpa. سَهْلَهْ pass.

سَهْوَلْمَا, pl. سَهْوَلْمَاتْمَا incisura.

لَهْلَمَةْ سَهْلَمَةْ laceratio.

سَهْلَمَةْ id.

سَهْلَمَةْ سَهْلَمَةْ rostrum, proboscis, nasus, ar. حُرْظَمَرْ.

سَهْلَمَةْ سَهْلَمَةْ et سَهْلَمَةْ سَهْلَمَةْ eicer.

سَهْلَمَةْ سَهْلَمَةْ , fut. سَهْلَمَةْ سَهْلَمَةْ combussit, torruit; cfr. ar. حَرَقَ.

Ethpe. سَهْلَمَةْ سَهْلَمَةْ pass.

Pa. سَهْلَمَةْ id. q. Pe. sed usitatus.

Ethpa. سَهْلَمَةْ سَهْلَمَةْ pass.

سَهْلَمَةْ سَهْلَمَةْ fomes ad ignem accendendum; aqua valde salsa, ar. حُرَّاقْ.

سَهْلَمَةْ سَهْلَمَةْ adustio; incendum.

سَهْلَمَةْ سَهْلَمَةْ rutabulum. ar. بِحَرَّاكْ movit.

سَهْلَمَةْ سَهْلَمَةْ adurens.

سَهْلَمَةْ سَهْلَمَةْ ut سَهْلَمَةْ سَهْلَمَةْ .

سَهْلَمَةْ سَهْلَمَةْ blanditus est *canis* caudam motitando; trop. adulatus est.

سَهْلَمَةْ سَهْلَمَةْ motitatio caudae.

سَهْلَمَةْ سَهْلَمَةْ adulator, blandus.

سَهْلَمَةْ سَهْلَمَةْ ervum *planta*, avena.

سَهْلَمَةْ سَهْلَمَةْ et سَهْلَمَةْ سَهْلَمَةْ stercus capreoli.

سَهْلَمَةْ سَهْلَمَةْ , fut. سَهْلَمَةْ سَهْلَمَةْ , excommunicavit, devovit; cfr. ar. حَرَمَ prohibuit.

Ethpe. سَهْلَمَةْ سَهْلَمَةْ pass.

Aph. سَهْلَمَةْ سَهْلَمَةْ devovit, inde destruxit, anathematizavit; in pios usus consecravit; cum imprecatione juravit.

Ettaph. سَهْلَمَةْ سَهْلَمَةْ pass.; ab ecclesiæ communione rejectus est.

سَهْلَمَةْ سَهْلَمَةْ , ar. حَرْمَمْ anathema, res destructioni devota; res Deo consecrata; excommunication; jusjurandum cum imprecatione; *nnq. trop.* mors; و سَهْلَمَةْ absit.

سَهْلَمَةْ سَهْلَمَةْ exsecrandus, saevus, ferox, fem. سَهْلَمَةْ - سَهْلَمَةْ scelesti homines. سَهْلَمَةْ سَهْلَمَةْ maledictus serpens.

سَهْلَمَةْ سَهْلَمَةْ subst. id. q.

سَهْلَمَةْ سَهْلَمَةْ saeve.

سَهْلَمَةْ سَهْلَمَةْ , pl. سَهْلَمَةْ سَهْلَمَةْ nequitia, crudelitas, violentia.

سَهْلَمَةْ سَهْلَمَةْ crudelis; - subst. basiliscus.

سَهْلَمَةْ سَهْلَمَةْ dure, crudeliter.

سَهْلَمَةْ سَهْلَمَةْ crudelitas, duritia.

سَهْلَمَةْ سَهْلَمَةْ anathematizans.

سَهْلَمَةْ سَهْلَمَةْ helluo.

سَهْلَمَةْ سَهْلَمَةْ cibi aviditas.

سَهْلَمَةْ سَهْلَمَةْ sorbus domestica.

سَهْلَمَةْ سَهْلَمَةْ , fut. سَهْلَمَةْ سَهْلَمَةْ asper, durus fuit; cfr. ar. حَرَشْ scabit.

Pa. سُنْتَ هَـ asperum reddidit,
exacerbavit.

Ethpa. سُنْتَ هَـ pass.

سُنْتَ هَـ et سُنْتَ هَـ scabies.

سُنْتَ هَـ piscis saxatilis.

سُنْتَ هَـ crassitudo palpebra-
rum.

سُنْتَ هَـ durities, asperitas ;
raucitas, *cfr.* حَرِسَ.

سُنْتَ هَـ asper, durus, raucus.

سُنْتَ هَـ durities, asperitas,
raucitas.

سُنْتَ هَـ rostrum ; proboscis ;
cfr. سُنْتَ هَـ ; in pl. coxa.

سُنْتَ هَـ , fut. سُنْتَ هَـ astutus
fuit; *denom.* flavus fuit. *Part.*
præs. سُنْتَ هَـ f. *emph.* سُنْتَ هَـ ;
subst. carthamus tinctorius.
cfr. *heb.* כַּרְמָה solers fuit, *et*
ar. إِخْرَجَ excogitavit res no-
vas.

Pa. سُنْتَ هَـ astute egit.

Ethpe. سُنْتَ هَـ id. q. *Pa.*

سُنْتَ هَـ astute.

سُنْتَ هَـ calliditas, astutia,
nequitia.

سُنْتَ هَـ et سُنْتَ هَـ flavus, f.
arsenici ; سُنْتَ هَـ وَسُنْتَ هَـ arseni-
cum ; carthamus tinctorius.
cfr. ar. خَرَبَ.

سُنْتَ هَـ astutus, fraudulentus ; -
subst. carthamus tinctorius.

سُنْتَ هَـ status corruptus; *cfr.*
ar. حَرِصَ corruptus est.

سُنْتَ هَـ , fut. سُنْتَ هَـ miscuit,
adulteravit rem; *cfr. ar.* حَرَفَ
Part. pass. سُنْتَ هَـ ; subst.
conviva.

Pa. سُنْتَ هَـ ut *Pe.* ; it. acuit,
incitavit.

Ethpa. سُنْتَ هَـ pass.

Aph. سُنْتَ هَـ acuit, incitavit.

سُنْتَ هَـ et سُنْتَ هَـ acies gladii,
culter.

سُنْتَ هَـ vel دَهْرَهْ subula sutoris
vel potius assumentum cal-
cei.

سُنْتَ هَـ vel سُنْتَ هَـ سُنْتَ هَـ acies, acumen ;
trop. vis, vigor ; it. agnus
anniculus, ar. حَرُوفَ .

سُنْتَ هَـ mixtura.

سُنْتَ هَـ id quod miscetur.

سُنْتَ هَـ compotatio.

سُنْتَ هَـ acutus, aer ;
trop. promptus, velox, sa-
gax.

سُنْتَ هَـ acriter, prompte.

سُنْتَ هَـ acies, acumen, acui-
tas ; trop. vis, vigor, celeri-
tas.

سُنْتَ هَـ daucus carota.

سُنْتَ هَـ , pl. سُنْتَ هَـ scarabeus
niger ; *cfr. ar.* حَلْقَسَ .

سُنْتَ هَـ ornithogale planta.

مَرْقُوماً pl. مَرْقُوماً grumus
grandinis (*gall. grêlon*).

مَرْقُوماً , fut. مَرْقُوماً , ar. حَرَقْ ,
præscidit, fregit, *inde metaph.* decidit, decrevit, præfinivit, statuit ; c. مَرْقُوماً abdicavit ; مَرْقُوماً مَرْقُوماً prædixit.
أَحْتَانَ مَرْقُوماً كَحْتَانَا tempus a Prophetis præmonstratum.

Ethpe. مَرْقُوماً pass.

Pa. مَرْقُوماً ar. حَرَقْ , acuit *dentes* ; frenduit.

Ethpa. مَرْقُوماً præcibus est.

Ettaph. مَرْقُوماً id.

مَرْقُوماً , pl. مَرْقُوماً scissio, terminus, finis; *trop.* decretum ; monile.

مَرْقُوماً sectio, turma, definitio, sententia ; stridor *dentium*.

مَرْقُوماً terminus, decretum, definitio.

مَرْقُوماً , مَرْقُوماً stridor dentium.

مَرْقُوماً et مَرْقُوماً acerbus.

مَرْقُوماً acerbitas ; astrictio.

مَرْقُوماً turba canum ; collare canum.

مَرْقُوماً separatis.

مَرْقُوماً talus pedis.

مَرْقُوماً joculator.

مَرْقُوماً , fut. مَرْقُوماً raucedine laboravit.

Pa. مَرْقُوماً dimisit debita ; manu-

misit, liberavit. *Part. act. et pass.* مَرْقُوماً liberans, liberatus, immunis.

Ethpa. مَرْقُوماً pass.

مَرْقُوماً et مَرْقُوماً raucitas.

مَرْقُوماً , pl. مَرْقُوماً liberatio, exemptio; salus, scheda emancipationis; foramen, *cfr.* سَهْوًا .

مَارْقُوماً sine sing. m. , pro quo مَارْقُوماً liber, nobilis, f. مَارْقُوماً libera, nobilis : pl. m. abst.

مَارْقُوماً , emph. مَارْقُوماً liberi, nobiles, optimates, f. مَارْقُوماً .

مَارْقُوماً libertae : *cfr.* ar. حَرَقْ .

مَارْقُوماً libere, more liberorum hominum. مَارْقُوماً illiberanter, impudenter.

مَارْقُوماً nobilitas.

مَارْقُوماً vel مَارْقُوماً libertas, nobilitas. مَارْقُوماً و مَارْقُوماً mors voluntaria.

مَارْقُوماً مَارْقُوماً libertas perfecta.

مَارْقُوماً sua sponte. مَارْقُوماً

مَارْقُوماً sui ipsorum potestas.

مَارْقُوماً liber, voluntarius.

مَارْقُوماً libere, voluntarie.

مَارْقُوماً , pl. m. مَارْقُوماً , مَارْقُوماً , f. مَارْقُوماً , liber, nobilis.

مَارْقُوماً , ar. مَارْقُوماً secta religiosa Arabum Iraqi.

مَارْقُوماً nobilis, praefectus, vizirus, princeps.

مَارْقُوماً raucitas.

لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ liber, voluntarie.	لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ vel لِبَرٌ مُحَسَّنٌ guttus.
لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ , سَهْوَةٌ libertas, liberatio; exemptio.	لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ سَهْوَةٌ gutturalis.
لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ liberator.	لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ سَهْوَةٌ prunus arbor et fructus.
لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ pro لِبَرٌ مُحَسَّنٌ , placenta.	لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ سَهْوَةٌ jugulum; catarrhus; angina.
لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ ramus spec. palmae; fissura, cfr. لِبَرٌ مُحَسَّنٌ .	لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ سَهْوَةٌ incantationis capax.
لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ et لِبَرٌ مُحَسَّنٌ fovea; vallum.	لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ سَهْوَةٌ , fut. لِبَرٌ مُحَسَّنٌ aravit, excavavit, seidit; ar. حَرَثٌ .
لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ , fut. لِبَرٌ مُحَسَّنٌ , ar. حَرَثٌ , mutus, surdus fuit, raucus factus est; tacuit; it. sed c. fut. لِبَرٌ مُحَسَّنٌ jugulavit.	Ethpe. لِبَرٌ مُحَسَّنٌ id. q. Ethpe.
Ethpe. لِبَرٌ مُحَسَّنٌ pass.; it. ut Pe.	لِبَرٌ مُحَسَّنٌ , pl. لِبَرٌ مُحَسَّنٌ aratio; attritio, fractio; vitriolum;
Pa. لِبَرٌ مُحَسَّنٌ obmutescere fecit, incantavit; jugulavit; immo- lavit.	لِبَرٌ مُحَسَّنٌ وَأَمْهَدٌ atramentum.
Ethpa. لِبَرٌ مُحَسَّنٌ incantatus est, obmutuit.	لِبَرٌ مُحَسَّنٌ pro لِبَرٌ مُحَسَّنٌ finis, v. s. سَمَّا .
لِبَرٌ مُحَسَّنٌ , incantamentum, veneficium.	لِبَرٌ مُحَسَّنٌ سَمَّا raucitas vocis.
Aph. لِبَرٌ مُحَسَّنٌ mutum reddidit.	لِبَرٌ مُحَسَّنٌ , fut. سَمَّا computavit; imputavit.
لِبَرٌ مُحَسَّنٌ , f. لِبَرٌ مُحَسَّنٌ et لِبَرٌ مُحَسَّنٌ , pl. f. لِبَرٌ مُحَسَّنٌ mutus, surdus, ar. أَخْرَسٌ .	c. لِبَرٌ مُحَسَّنٌ pers.; aestimavit, reputavit; حَسْبَنْتُ حَسْبَنْتُ pone me ita fecisse. Part. pass. سَمَّا aestimatus, etc.
لِبَرٌ مُحَسَّنٌ surditas, mutitas.	act. imputans; cfr. ar. حَسْبَنْتُ .
لِبَرٌ مُحَسَّنٌ , magus, incantator; magia, incantatio.	لِبَرٌ مُحَسَّنٌ أَيْهَ حَكَ حَكَنْدَا مَنْ quid tibi negotii mecum est?
لِبَرٌ مُحَسَّنٌ , pl. لِبَرٌ مُحَسَّنٌ ars magorum.	Ethpe. لِبَرٌ مُحَسَّنٌ pass.
لِبَرٌ مُحَسَّنٌ raucus.	Pa. سَمَّا numeravit.
لِبَرٌ مُحَسَّنٌ , vel لِبَرٌ مُحَسَّنٌ raucitas, angina.	Ethpa. لِبَرٌ مُحَسَّنٌ , meditatus est, secum reputavit; excogitavit, machinatus est.
	لِبَرٌ مُحَسَّنٌ سَمَّا cogitatio; lamentatio.

سَعْدَسْتَ investigator, computator.

سَعْدَسْتَمَا mens; ars computandi.

سَعْدَسْتَرَا, *pl.* **سَعْدَسْتَرَا**, cogitatio, supputatio, ratiocinatio ; consilium ; *ap. gram.* subauditio ; *it.* cervical, *cfr.* **سَعْدَسْتَهُ** - **سَعْدَسْتَهُ**, inconside-
rate. **سَعْدَسْتَهُ** **سَعْدَسْتَهُ** **وَأَوْسَعَهُ** mentis cogitationes. **سَعْدَسْتَهُ** **سَعْدَسْتَهُ** **حَبَّهُ** **سَعْدَسْتَهُ** consilium inierunt ; *c. ۷۰* ma-
chinati sunt.

سَعْدَسْتَهُ cogitativus, mentalis ; *ap. gram.* subauditus.

سَعْدَسْتَهُ **نَمَدَا** **سَعْدَسْتَهُ** nomen subauditum, pronomen.

سَعْدَسْتَهُ subauditio.

سَعْدَسْتَهُ, *pl.* **سَعْدَسْتَهُ** enumeratio, supputatio, computatio ; census, summa, ratio quæ reddi-
tur, opinio ; *ar.* حَسْبَان ; *it.* cervical, *in pl.* ars numero-
rum, arithmeticæ. **سَعْدَسْتَهُ**, **لَا سَعْدَسْتَهُ**, sine numero, innumerabilis.

سَعْدَسْتَهُ **لَا سَعْدَسْتَهُ** propter. **سَعْدَسْتَهُ** numeralis, ad numerum spectans.

سَعْدَسْتَهُ cogitans, cogitandi facultate præditus.

سَعْدَسْتَهُ cogitatio, consideratio.

سَعْدَسْتَهُ computator, astrologus.

سَعْدَسْتَهُ, *pl.* **سَعْدَسْتَهُ**, cogitatio, mens, consilium.

سَعْدَسْتَهُ mentalis, rationalis.

سَعْدَسْتَهُ **et سَعْدَسْتَهُ** **سَعْدَسْتَهُ** cogitabilis, cogitativus.

سَعْدَسْتَهُ **سَعْدَسْتَهُ** cogitatio.

سَعْدَسْتَهُ, *fut.* **سَعْدَسْتَهُ** utilis fuit, profuit, *pler. in part.* usitator : **سَعْدَسْتَهُ**, **سَعْدَسْتَهُ**, utilis, aptus, decens, necessarius. **سَعْدَسْتَهُ** utilior quam ; *nnq. act.* opus habens ; *it. subst. in pl. emph.* **سَعْدَسْتَهُ** res necessariæ : verba usitata.

Pa. سَعْدَسْتَهُ ut Pe.

Ethpa. **سَعْدَسْتَهُ** usus fuit, *pler. c.* **سَعْدَسْتَهُ** **reī** ; tractavit, familiaritatem habuit, *c. سَعْدَسْتَهُ pers.* ; mulierem cognovit, *c. سَعْدَسْتَهُ vel سَعْدَسْتَهُ pers.* ; oblectatus est.

سَعْدَسْتَهُ, *pl.* **سَعْدَسْتَهُ** usus, neces-
sitas ; necessaria subsisten-
tia ; debitum, officium ; usus
loquendi, vocabula.

سَعْدَسْتَهُ usus, utilitas.

سَعْدَسْتَهُ, **لَا سَعْدَسْتَهُ** **وَلَا سَعْدَسْتَهُ** utilitas.

سَعْدَسْتَهُ utilis.

سَعْدَسْتَهُ utiliter.

سَعْدَسْتَهُ, **سَعْدَسْتَهُ**, usus.

سَعْدَسْتَهُ, *fut.* **سَعْدَسْتَهُ** obseuratus

est ; it. <i>impers.</i> مَعْدُّ adves-	ptisana.
perascit.	
Pa. سَعْيٌ obscuravit ; vespere	سَعْلَ et سَعْلَ aurifex.
aliquid fecit. مَدْفَعَهُ مَدْسَعَهُ لِي	سَعْلَ كَنْتَا id.
venit mane et vespere.	سَعْلَ كَنْتَا conflatio.
Ethpa. سَعْلَ pass.; trop. excae-	سَعْلَ مَسْعَلَهُ pl. مَسْعَلَهُ tempestas,
catus est.	agitatio fluctuum, fluctus ;
Aph. سَعْلَ obtenebravit.	trop. periculum.
Ettaph. سَعْلَ pass.	سَعْلَ verb. den. a prae-.
سَعْلَ , pl. سَعْلَتَنَّa tenebrae, caligo ;	fluctibus agitatus est.
it. eclipse.	سَعْلَتَنَّa procellosus.
سَعْلَtenebrae ; it. vertigo.	سَعْلَتَنَّa id.
سَعْلَtenebrosus.	سَعْلَتَنَّa tempestas.
سَعْلَ obseurus ; trop. miser,	
inops.	
سَعْلَ , f. سَعْلَهُ , tene-	
brosus, turbidus ; subst. in f.	
tenebrae.	
سَعْلَتَنَّa obseuritas, pl. سَعْلَتَنَّا .	سَعْلَهُدَهُ - Aph. سَعْلَهُدَهُ coenavit.
سَعْلَتَنَّa et سَعْلَهُدَهُ tenebrosus.	سَعْلَهُدَهُ et سَعْلَهُدَهُ , pl. سَعْلَهُدَهُا
سَعْلَتَنَّa obseuritas.	cœna.
سَعْلَهُدَهُ obtenebrans.	سَعْلَهُ id.
سَعْلَهُدَهُ , fut. سَعْلَهُ confla-	
vit, fabricavit: struit, machi-	
natus est ; it. meditatus est ;	
لِي سَعْلَهُدَهُ conspiravit.	
Ethpe. سَعْلَهُ pass.	سَعْلَهُ passus est ;
Pa. سَعْلَهُ fabricavit.	compassus est, doluit ; cfr.
سَعْلَهُ ars aurificis.	ar. حَسْنَهُ . Part. præs. سَعْلَهُ ،
سَعْلَهُ , pl. سَعْلَهُ كَنْتَنَّa conflatio ; it.	لَامَهُ vel سَعْلَهُ patiens ; subst.
conflatile, aurificium, orna-	ap. gramm. passivum ; ac-
menta mulierum.	cusativus. Part. pass. سَعْلَهُ ،
	سَعْلَهُ ; adj. conscius ; سَعْلَهُ مَقْرَبٌ
	compatientes (εὐπαθοῦντες).
	Aph. سَعْلَهُ pati fecit, afflixit.
	سَعْلَهُ كَنْتَنَّا , pl. كَنْتَنَّا كَنْتَنَّا
	theopaschita, haereticorum sec-
	tae nomen.

سما, pl. سما passio, compassio; compunctio, dolor, tristitia. it. spec. in plur. affectiones, passiones animae, libido; cfr. ar. حسّ sensus. سما vel سما coram sensu: ex adverso; palam, aperte.

سما et سما, passio, sensus, sentiendi facultas; cfr. ar. حاسة.

سما vel سما, thymus.

سما passione abreptus.

سما cum passione, dolenter, cum compassione.

سما passionibus, cupiditatibus deditus; pravus, perversus; gram. passivum.

سما ad passionem spectans, passibilis, compatiens, misericors; ap. gram. passivum, accusativus.

سما passive.

سما passibilitas; ap. gram. passivitas. e. ی impassibilitas.

سما affectibus obnoxius; contristatus; luctuosus, tristitia afficiens; mq. id. q. سما conscientius.

سما cum dolore, tristitia.

سما pati faciens, affligens, f. سما; ap. gramm. activum verbum.

السما passio.

السما et مأسينا affligens.

السما doloris infletio.

سما, fut. سما signavit, obsignavit sigillo; munit signo crucis; occlusit, cicatricem duxit; trop. ad finem perduxit, complevit; intr. se occlusit. Part. act. سما; subst. sigillum, signum: cicatrix; cfr. ar. حفنة.

Ethpe. سما signatus est.

Pa. سما id. ac Peal.

Ethpa. سما absolutus, perfectus est.

سما, سما signatio, cicatricis inductio; signum.

سما, سما conclusio, finis; lectio completa, finalis oratio.

سما obsignator, rem confirmans, perficiens.

سما, ar. حفيه, affinis, gener; sponsus.

Pa. سما v. denom. desponsavit.

Ethpa. سما nupsit, matrimonio junctus est; trop. conjunctus est.

سما despensatio, nuptiae.

سما affinitas.

مسَدْنُ affinem faciens, f. مَسَدْنَةً.

مسَدْنُ inus. in Pe.; cfr. مَسَدْنَةً.

Pa. مَسَدْنَةً confregit.

Ethpa. مَسَدْنَةً pass.

مسَدْنَةً conftractio.

مسَدْنَةً id.

مسَدْنَةً — cfr. خَطَرٌ superbe progressus est.

Ethpe. مَسَدْنَةً se jactavit.

Pa. مَسَدْنَةً superbivit.

Ethpa. مَسَدْنَةً ut Ethpe.

Aph. مَسَدْنَةً superbum reddidit, inflavit.

مسَدْنَةً fastus.

مسَدْنَةً superbus, inflatus ; glorians.

مسَدْنَةً superbia.

مسَدْنَةً، مَسَدْنَةً superbia ; gloria, decus.

مسَدْنَةً mollis, tener.

مسَدْنَةً viriditas ; cfr. ar. خَضْرٌ viruit.

مسَدْنَةً مَسَدْنَةً superbiā excitans.

مسَدْنَةً مَسَدْنَةً superbia ; fastus.

مسَدْنَةً inus. — Pa. مَسَدْنَةً accu-

rate definivit, comprobavit ;

cfr. ar. مَحَاطٌ et حَاطَ :

Ethpa. مَسَدْنَةً pass.

Palp. مَسَدْنَةً, ar. حَذَّتْ et حَذَّخَتْ, excitavit ; allexit, sollicitavit ; titillavit.

Ethpalp. مَسَدْنَةً pass.

مسَدْنَةً incitamentum, blandimentum, excitatio ; titillatio, pruritus.

مسَدْنَةً concupiscentiam excitanς.

مسَدْنَةً، مَسَدْنَةً accuratus, exactus ; comprobatus, certus, verus ; purus, genuinus, merus ; ap. gram. regularis. ، مَوْرِي مَسَدْنَةً verum est quod, certum est quod.

مسَدْنَةً accurate, diligenter ; vere, proprie, certe, regulariter.

مسَدْنَةً exactitudo, integritas, veritas, sinceritas ; ap. gramm. regularitas. مَسَدْنَةً accurate, vere.

مسَدْنَةً saccus, v. s. مَسَدْنَةً .



§ nona littera alphabeti Syrorum; numerice valet : 9, etc., confer superiores litteras. Respondet geminæ litteræ arabicæ ش et ش ; nnq. cum arab. ش, ش et cum hebr. ش permutatur, ut : ش, شان, شن occidit, شکل, شن قتل umbra, شش ذبة, شش mactavit.

أَدَنْ, fut. أَدَنْ bene fuit; feliciter se habuit res; أَدَنْ خَدْ valuit, laetus fuit. أَدَنْ حَكْمَهُ لَهُ لَهُ fuit animo. حَكْمَهُ بَهْرَةُ أَدَنْ مِنْهُ فَ placuit ei; c. مِنْ melior fuit. Ethpe. أَدَنْلِ felix fuit, laetus factus est.

Pa. بَهْنَتْ benefecit; paravit. Part. act. مَهْنَدْ nnq. مَهْنَادْ; مَهْنَهْ se parat. Part. pass. مَهْنَهْ, مَهْنَهْ - adj. præsens, nnq. habitans.

Ethpa. بَهْنَادْ pass. et reflex.; inde adfuit, advenit.

Aph. بَهْنَادْ recte egit, benefecit; reparavit.

أَحَدْ bonus successus rei, prosperitas.

مَنْدَهْ, مَنْدَهْ, pl. مَنْدَهْ gratia, benignitas; beneficium, eleemosyna; gratiarum actio; trop. oleum sacrum infirmorum vel catechumenorum; massa ex reliquiis sanctorum confecta, cfr. سَنْتْ; adverb. مَنْدَهْ لِكَنْ دeo gratias. مَنْدَهْ vel حَفْ حَفْ مَنْدَهْ mihi benigne fecit; مَنْدَهْ beneficia contulit in aliquem e. مَنْدَهْ مَنْدَهْ مَنْدَهْ gratias tibi egit; gratum, benignum se præbuit erga te.

مَهْمَهْ præparatio, dispositio; conatus. حَبْ كَهْمَهْ se paravit. كَهْمَهْ كَهْمَهْ etymologia, locutio derivata ex confusione Syrorum inter ἐποιολογία et ἐπομελογία.

مَهْمَهْ et minus recte بَهْنَادْ benefactor.

مَهْنَادْ et minus recte مَهْنَهْ beneficentia.

مَهْنَهْ promptitudo.

مَهْنَهْ مَهْنَهْ prompte, parate.

بَحْر, v. s. بَحْر .

مَهْمَنْتَهْ رَهْوَزْ , saltem.

مَهْمَنْتَهْ رَهْوَزْ , ar. طَازُوسْ , pavo.

مَهْمَنْتَهْ , v. s. بَحْر .

بَلْكَهْ تَلْكَهْ رَهْلَيْرَى , conchylii species (gall. telline).

مَهْمَنْتَهْ , ar. pers. طَيَّانْ amiculum.

أَفْرَقْ رَهْلَوْزْ , cinis.

مَهْمَنْتَهْ رَهْلَوْزْ , portio, demensum.

مَهْمَنْتَهْ تَارْتَارْ , Tartarus, inferi.

مَهْمَنْتَهْ et مَهْمَنْتَهْ تَارْتَارْ , corona lapidum in pariete prominens (ar. طَافِرَنْ).

مَهْمَنْتَهْ تَارْتَارْ , planta pedis.

بَحْر, fut. بَحْر quæsivit, rescivit.

Ethpe. بَحْر اَلْيَدْ divulgatus est, pererebuit; serpsit rumor; cfr. heb. בָּבֶל et ar. بَلْ rep. sit.

Pa. بَحْر divulgavit.

Ethpa. بَحْر اَلْيَدْ pass. divulgatus est; celebris factus est.

Aph. بَحْر et minus recte بَلْ nuntiavit, prædicavit; c. بَلْ rei, nominavit, renuntiavit, de re docuit.

بَحْر , ar. بَلْ , lacerta.

بَحْر , بَحْر et بَلْ اَدَمْ nuntius, fama; trop. status, modus

agendi; ap. gramm. prædictum, (*id. q. ar.* خَبَرْ). مَهْمَنْتَهْ qualis nuntius tuus: quis es tu? qualis status tuus? quid agis?

بَحْر , v. s. بَهْلَهْ .

بَحْر اَهْدَى præco, nuntius.

بَحْر اَهْدَى , بَحْر famous, insignis, multus; ap. gramm. frequens *vel* regularis.

بَحْر اَهْدَى celebritas.

مَهْمَنْتَهْ et minus recte بَلْ اَهْدَى , f. emph. بَلْ اَهْدَى internuntius.

بَلْ اَهْدَى et بَلْ اَهْدَى nuntiatio.

بَلْ اَهْدَى festum Annunciationis.

بَلْ اَهْدَى obsonium ex acido laete confectum, ar. كَامَةْ .

بَلْ اَهْدَى , pers. طَبَرْزِيْنْ securis, cfr. بَلْ اَهْدَى ; it. sal candidum, pers. طَبَرْزِيْجْ .

بَلْهَلْ , fut. بَلْهَلْ mactavit, confregit; cfr. ar. ذَبَحْ et ذَبَحْ ; it. humectavit, rorem *vel* imbrex effudit (*cælum*); cfr. ar. طَلَقْ exundavit.

Ethpe. بَلْهَلْ اَلْيَدْ confractus est.

Pa. بَلْهَلْ penitus confregit.

Ethpa. بَلْهَلْ اَلْيَدْ pass.

بَلْهَلْ اَهْدَى , pl. بَلْهَلْ macellum;

- it. pulmentum; خَمْهَ حَتْتَا culina.
- ماكْتَاتَا mactator; coquus, ar. طَبَّاخٌ.
- ماكْتَاتَةَ حَتْتَةَ mactatio.
- ماكْتَاتَةَ حَتْتَةَ confractio, mactatio.
- حَتْتَةَ m., pl. حَتَّاتَهُ, heb. حَتَّاتَهُ et ar. ظَبَّيْ, st. c. حَتَّتَهُ; c. aff. 1^o. p. حَتَّسَ, f. pl. حَتَّادَهُ, pl. حَتَّادَهُ capra, capreolus; caprea, dorcas.
- حَلَّلَةَ لَحَلَّلَةَ, ar. طَبَنَ, tympanum.
- حَكَمَةَ حَكَمَةَ dim. prec. tympanum parvum.
- حَلَّلَةَ verb. den. tympano lusit.
- حَلَّلَةَ ornamentum muliebre.
- حَكَمَةَ حَكَمَةَ hydropysis species.
- حَكَمَةَ حَكَمَةَ, pl. حَكَمَةَ tabula altaris, *inde* altare; tabula ludi latrunculorum (*gall.* échiquier).
- حَكَمَةَ حَكَمَةَ et حَكَمَةَ tabellarius, cursor.
- حَكَمَةَ حَكَمَةَ tabellarii officium.
- حَكَمَةَ حَكَمَةَ tabellarii vel cursoris more.
- حَكَمَةَ حَكَمَةَ tabularius (*gall.* archiviste).
- حَكَمَةَ حَكَمَةَ ferreæ jumentorum soleæ.
- حَدَّدَهُ, fut. نَهَّهُ et حَدَّهُ, fut. نَهَّهُ, f. emph.
- mersus est, se immersit; signavit, sigillo munivit; cudit nummos; trop. in somno, voluptate demersus est. Part. pass. حَتَّسَ, حَتَّاتَهُ, f. pl. حَتَّادَهُ; subst. claustra reticulata; cfr. heb. حَبَّنَ et ar. طَبَّعَ.
- Ethpe. حَدَّهُ pass.
- Pa. حَدَّهُ mersit, immersit; infixit.
- Ethpa. حَدَّهُ pass. immersus est, impressus est, signatus est.
- Ettaph. حَدَّهُ pass. immersus est.
- حَدَّهُ submersio, impressio; obsignatio.
- حَدَّهُ, pl. حَدَّهُ sigillum, signaculum; gemma; impressum signum, typus matrix; trop. stylus, rhythmus; species; panis obsignatus nondum consecratus; palus; in pl. sigilla virginitatis.
- حَدَّهُ imprimens, immergens.
- حَدَّهُ et حَدَّهُ حَدَّهُ orbiculus utris; ricinus seu species tineæ.
- حَدَّهُ, f. حَدَّهُ, f. حَدَّهُ imversus; sopitus.
- حَدَّهُ حَدَّهُ immersio; depresso.
- حَدَّهُ حَدَّهُ submersio, subversio; trop. somnolentia.
- حَدَّهُ حَدَّهُ, f. emph.

مَحْدُوكْتَهَا submersens; subversor.

سَرْتَاجْهُمْ et سَرْتَاجْهُمْ sartago; panis in sartagine coetus; cfr ar. طَبَقَةٌ, et pers. طَبَقَ.

سَرْتَاجْهُمْ , pers. طَبَقَةٌ , securis; cfr. سَرْتَاجْهُمْ .

سَرْتَاجْهُمْ saccharum album, pers. - ar. طَبَقَةٌ .

سَرْتَاجْهُمْ pers.-ar. طَبَقَةٌ , creta (gall. craie).

سَرْتَاجْهُمْ gemitus, compunctio.

سَرْتَاجْهُمْ , سَرْتَاجْهُمْ , سَرْتَاجْهُمْ et سَرْتَاجْهُمْ , sartago; trop. angustiae; cfr. سَرْتَاجْهُمْ , et ar. طَاجِنٌ .

Pa. سَرْتَاجْهُمْ v. denom. sartagine coxit relfrixit; trop. cruciavit.

Ethpa. سَرْتَاجْهُمْ pass. ; trop. in angustiis constitutus est.

سَرْتَاجْهُمْ - Inus. in Pe.; cfr. ar. سَرْتَاجْهُمْ gravatus est.

Ethpe. سَرْتَاجْهُمْ vexavit, dure tractavit, c. سَرْتَاجْهُمْ pers.

Ethpa. سَرْتَاجْهُمْ id. q. Ethpe.; it. rixatus est.

سَرْتَاجْهُمْ et سَرْتَاجْهُمْ contentiosus, calumniator.

سَرْتَاجْهُمْ objurgatio, disceptatio; contumelia : dolus.

سَرْتَاجْهُمْ disputator, rixosus.

سَرْتَاجْهُمْ , turc.- pers. طَفَرَى sig-

num regium in fronte edicti impressum.

سَرْتَاجْهُمْ mensuræ vel ponderis nomen.

سَرْتَاجْهُمْ caudæ resectæ avis.

سَرْتَاجْهُمْ , fut. سَرْتَاجْهُمْ erravit, vagatus est; cfr. سَرْتَاجْهُمْ .

سَرْتَاجْهُمْ vagatio, aberratio.

سَرْتَاجْهُمْ id. q. سَرْتَاجْهُمْ .

سَرْتَاجْهُمْ stirps, familia, cognatio, gens, tribus; cfr. ar. سَرْتَاجْهُمْ genus hominum. سَرْتَاجْهُمْ cognatus ; ex nobili familia natus.

سَرْتَاجْهُمْ stirpe nobilis.

Pa. سَرْتَاجْهُمْ v. denom. cognatum, affinem fecit; familiarem reddit. Part. pass. سَرْتَاجْهُمْ ; adj. stirpe nobilis, f. سَرْتَاجْهُمْ .

Ethpa. سَرْتَاجْهُمْ pass. affinitate, cognatione conjunctus est.

Aph. سَرْتَاجْهُمْ id. q. Pa.

سَرْتَاجْهُمْ nobilitas stirpis.

سَرْتَاجْهُمْ affinis.

سَرْتَاجْهُمْ meridies, ar. سَرْتَاجْهُمْ .

سَرْتَاجْهُمْ et سَرْتَاجْهُمْ meridianus, pl. f. سَرْتَاجْهُمْ .

سَرْتَاجْهُمْ et سَرْتَاجْهُمْ حَسْنَةٌ tempore meridiano.

سَرْتَاجْهُمْ , fut. سَرْتَاجْهُمْ assatus est,

trop. defecit; cfr. ar. طَهَا assavit.

Ethpe. مُفْتَأِي assatus est.

Pa. مُفْتَأَي assavit, exussit; trop. vastavit.

Ethpa. مُفْتَأِي pass.

مَوْتٌ et مَوْتَهُ assatio.

مَهْمَةٌ assator; f. emph.

مَهْمَهٌ forceps.

مَهْمَهٌ assatio.

۵۷ - Pro inusit. Pe. بُخْ

usurpatur اَبَدٌ q. videoas.

بُخْ , pl. بُخَاتٍ , بُخْ bonum,

proventus terrae, beatitudo; interjective usurpatur, in st.

abst. : بُخْ beatitudo ei

qui: beatus qui.

بُخْ وَزِدْ مَنْمَانٌ felix ego quia vult

Dominus salutem meam! ; - in

st. c. plur. cum pronomine

suffixo, c. vel sine ribbui.

بُخْتَنَاتٍ beatitudines

homini : beatus homo.

بُخْتَنَاتٍ كُبْ beatitudines

tue, beatitudo tibi : beatus

es. بُخْتَنَاتٍ beata est.

بُخْتَنَاتٍ beati sunt.

بُخْتَنَاتٍ beatum dixit; -

بُخْتَنَاتٍ dignus congratulationibus : gratula-

tulandus.

بُخْ , f. emph. بُخْ ,

st. c. بُخْ , pl. m. بُخَاتٍ

f. بُخْتَنَاتٍ bonus, præ-

stans, nobilis; suavis; pre-

sus, æquivalens *pretio*; - c.

بُخْ , melior, melius; subst.

speciat. in st. emph. f. bonum,

prosperitas; bonitas, virtus;

benignitas, beneficium, gra-

titia; præmia; وَبِرْمَيْتَنَا

primates civitatis. مَلَكَتْنَا

بُخْ benigne eum allocutus

est; c. suff. بُخْ bonum

meum, مَلَكَتْنَا bonum eorum.

بُخْ benefici eorum; c. بُخْ gratias red-

didit; كُبْ si tibi placeat. - Adverb.

بُخْ multum, bene: c. بُخْ melius,

potius, magis, longe. وَحْدَهُ بُخْ permagnus.

بُخْ admodum, magnopere.

بُخْ quam maxime. حَسْنَهُ بُخْ potius

quam; دَهْ بُخْ etsi, quamvis.

بُخْ bene, recte.

بُخْ , بُخْ bonitas.

بُخْ beatus, f. emph. بُخْ .

بُخْ beate.

بُخْ beatitudo.

بُخْ felix, beatus.

بُخْ beatitudo.

Beatitudo Vestra, *titulus honori-*

ficis Patriarchæ vel Epis-

copi.

بُخْ tibiale.

سَمْلَه, pers. شُبُرْه, saccus pabulatorius jumenti.

تَكْلِه vox latina, toga.

سَمْلَه opulentia, superbia.

سَمْلَه vel potius Pa. سَمْلَه
amovit; cfr. ar. طَارَ, aber-
ravit, et طَرَّ.

سَمْلَه et **سَمْلَه** spatium tempo-
ris.

سَمْلَه - cfr. ar. طَنَطَنَ demisit
caput.

Pa. سَمْلَه dedit, tradidit.

Ethpa. سَمْلَه لِ supplicavit.

سَمْلَه supplicatio, preces.

سَمْلَه deprecatio, suppli-
catio.

سَمْلَه, pl. سَمْلَه botrus,
labrusca.

سَمْلَه undae, fluctus.

سَمْلَه tuthia; cfr. ar. ثُثِيَا,
(gall. zinc, antimoine).

سَمْلَه luscinia.

سَمْلَه - *Pa.* سَمْلَه obambu-
lavit.

Ethpa. سَمْلَه id.

سَمْلَه obambulatio. سَمْلَه لَفَنْتَه
latrina.

سَمْلَه, ar. تُوْلُول, verruca.

سَمْلَه سَمْلَه مَهْمَصَه, palpebra-
rum durities.

سَمْلَه contradictio, oppo-
sitio.

سَمْلَه تَوْلَه, liber; epistola.

سَمْلَه تَوْلَه, tonus, pl. سَمْلَه,
سَمْلَه syllabæ.

سَمْلَه, fut. سَمْلَه volavit;
trop. saliit, vagatus est.

سَمْلَه volatus.

سَمْلَه id; -it. pavo, pl. سَمْلَه.
طَارُوس, ar. طَارُوس.

سَمْلَه et **سَمْلَه** qui alte volat.

سَمْلَه volatus cum gyratione
in aere.

سَمْلَه, fut. سَمْلَه natavit,
supernatavit, inundavit, inun-
datus est; trop. in superficie
mansit, levis fuit.

Ethpe. سَمْلَه لِ inundatus est.

Pa. سَمْلَه inundavit, submersit.

Aph. سَمْلَه natare fecit, exun-
davit, submersit.

سَمْلَه et **سَمْلَه** natatio, navigatio;
ratis, ar. طَوفَان.

سَمْلَه, gutta v. s. سَمْلَه.

سَمْلَه id. q. سَمْلَه سَمْلَه.

سَمْلَه inundatio, diluvium,
ar. طَوفَان.

سَمْلَه ad diluvium spectans.

سَمْلَه natator, navigator, pl.
سَمْلَه omenta viscerum.

لَهْفَا	inundatio.	لَهْفَا	quantum temporis ; cfr. ar. طَرِزَ limes, طَرِزَا una vice.
لَهْفَا	superficialis seu incuriosus.	- adverb.	لَهْفَا دِيُو diu.
لَهْفَا	superficialiter, incuriose.	لَهْفَا	pl. لَهْفَاتْهَا pl. طَرِيقَاتْهَا mons; cfr. ar. طَرِيْرَه et heb. طَرِيْرَه.
لَهْفَا	innatatio.	لَهْفَا	montanus, f. لَهْفَاتْهَا subst. regio montana.
لَهْفَا	natatio.	لَهْفَا	septum, ovile; cænobium ; cfr. ar. طَارِدَةَ دَرَّازَه et heb. طَارِدَةَ دَرَّازَه.
لَهْفَا	navigabilis.	لَهْفَا	تَوْرَاهْ تَوْرَاهْ tornus.
لَهْفَا	exundatio fluctuum.	لَهْفَا	et قَلْمَاهْ, vide لَهْفَا et قَلْمَاهْ.
لَهْفَا	τοπάζιον, topazion.	لَهْفَا	fut. لَهْفَاهْ linivit, illevit; trop. adjunxit, falso attribuit.
لَهْفَا	προκλητικός, procellosus ventus.	Ethpe.	لَهْفَاهْ pass.
لَهْفَا	τοπική, topica, pars rhetoricae de locis communibus tractans ; pl. قَلْمَاهْ et لَهْفَاتْهَا τοπιكَةَ, loca communia seu generalia.	Pa.	لَهْفَا polluit, inquinavit ; Part. act. مَلْهَفَاهْ . Part. pass. مَلْهَفَاهْ , مَلْهَفَاهْ ; trop. profanus.
لَهْفَا	v. s. قَلْمَاهْ .	Ethpa.	لَهْفَاهْ pass.
لَهْفَا	pl. قَلْمَاهْ , τοπάρχης, toparcha, præ fectus regio-nis.	لَهْفَا	pollutio ; bubalus.
لَهْفَا	id. q. حَمْهَا .	لَهْفَا	et لَهْفَا pollutio.
لَهْفَا	fut. لَهْفَاهْ volavit ; usit. in part. præs. لَهْفَا volans ; cfr. ar. طَارَ volavit.	لَهْفَا	لَهْفَا illitio, litura.
Aph.	لَهْفَاهْ volare fecit ; لَهْفَاهْ animum adjicias.	لَهْفَا	لَهْفَاهْ pollutio.
لَهْفَا	pl. لَهْفَاتْهَا f., avis, spec. avis prædatrix, cfr. ar. طَيْرَه .	لَهْفَا	لَهْفَاهْ sordes, inquinatio.
لَهْفَا	mensura, spec. spatium, intervallum, momentum.	Lَهْفَا	لَهْفَا jejonus ; adverbial.
	فَهْمَا	لَهْفَا	usurpatum, jejune. لَهْفَا remansit jejonus (ar. لَهْفَا طَارِيْرَه).

- تَهْبِي**, fut. تَهْبَي turbavit.
- تَهْبِي**, fut. تَهْبَي turbatus.
- Ethpalp.* تَهْبَي turbatus est.
- تَهْبِي perturbatio.
- طَحَّالٌ, ar. طَحَّالٌ, splen, lien.
- تَهْبِي et تَهْبِي splene laborans.
- تَهْبِي**, fut. تَهْبَي moluit, comminuit; تَهْبَي وَهَدَى Scripturæ verba adulteravit.
- Ethpe.* تَهْبَي pass.
- Pa.* تَهْبَي ut *Peal*.
- تَهْبِي molitura; masticatio.
- تَهْبِي, pl. تَهْبِي, f. تَهْبِي, pl. تَهْبِي, ar. طَحَّانٌ, molitor, molitrix; in pl. dentes molares.
- تَهْبِي molitus, ar. طَحِينٌ.
- تَهْبِي mola, ar. طَحُونٌ.
- مَهَبَّةً تَهْبِي molitus.
- تَهْسِي**, fut. تَهْسِي tenesmo laboravit.
- Ethpe.* تَهْبَي id.
- تَهْسِي tenesmus, ar. طَحَّار et تَهْبِي.
- تَهْسِي podex; haemorrhoides.
- تَهْسِي vehementior tenesmus.
- تَهْسِي تَهْسِي, pl. تَهْسِي تَهْسِي, quarta indictio, tetrarcha.
- تَهْسِي tetrarchia.
- تَهْبَي, pl. تَهْبَي, et تَهْبَي, pl. تَهْبَي et تَهْبَي podex.
- تَهْبَي, pl. تَهْبَي et تَهْبَي usit. in pl. tantum albugo; oculorum sordes.
- تَهْبَي albagine affectus oculus.
- تَهْبَي, ar. طَافِي, ex tribu arabica Tay; arabs in genere; moslemus.
- تَهْبَي arabice.
- تَهْبَي gens Arabum; islamismus.
- تَهْبَي rel. تَهْبَي nomen avis, ar. طَيْطَرِي.
- تَهْبَي vox lat. titulus, inscriptio, pl. تَهْبَي.
- تَهْبَي تَهْبَي τεταρταιος, quadruana febris.
- تَهْبَي et تَهْبَي, pl. تَهْبَي, st. c. تَهْبَي, τιμηή, pretium.
- تَهْبَي ταχεῖον, thesaurus regius.
- تَهْبَي ταχεῖον, fiscus.
- تَهْبَي, pers. تَهْبَي, liber, tomus.
- تَهْبَي, ar. حَنِينٌ, lutum.
- تَهْبَي, pl. تَهْبَي luteus.
- تَهْبَي τέκτων, faber.
- تَهْبَي τεκτονική, ars technica.
- تَهْبَي et تَهْبَي, v. s. وَهَدَى.

γέ et *γέ τάχις*, forte; quin etiam, num.

بُلْلِيْت bullivit.

ابولیتیو ebullitio.

لِحَادُ [ٌ] pl. **لِحَادَاتٍ** *réyvñ*, modus, ars, spec. artificium, fraus.

دُلُوسٌ dolosus.

Pa. فُلْ v. denom. a فُلْ, arte, artificio usus est; decepit.

Ethpa. ~~ئەڭلە~~ *id.*; confinxit,
confictus est.

دُلُس dolus, fraus, machinatio.
دُلُسُ dolosus, versutus.

حَتَّىٰ لَجَّهُوا, pl. لَجَّهُمْ id. لَجَّهُوا
لَجَّهُمْ satellites.

فَخَّ v. *denom.* ordinavit, composuit; collocavit, stait; ad ordinem sacrum promovit, instituit, constituit; distribuit. **فَخَّ** particulam Eucharisticam rite sumpsit. *Part. pass.* **فَخَّ**, **فَخَّ**; *trop.* modestus.

Ethpa. مَدْلِي pass.

وَقْدَهُ ، وَقْدَهُ ; ordo de re et
pers., Ordo sacer; ordinatio,
regula; communio eucharis-
tica; tractatus.

مُحْكِمٌ ordinator, conscriptor;
ritum missæ perficiens seu
celebrans presbyter; ap.
gramm. ordinalis numerus.

اِسْمَاعِيل, pl. اِسْمَاعِيلات ordination, regularitas; ordo; hierarchia; regula. اِسْمَاعِيلات نہ inordinatio.

الْمُهَدَّدَةُ communio eucharisti-
ca, ordinatio; c. ፩ inordinatio.

لِمَّا ordine insignitus.

μόντοκη ταξιώτης, apparitor,
officialis judicum.

لُكْتَنْ, pl. **لُكْتَنَاتْ**, **لُكْتَنَةِ**, **لُكْتَنَةِ**,
st. c. **لُكْتَنْ**, natu parvus;
minister, servus, satelles; c.
suff. **لُكْتَنْ** vel **لُكْتَنَاتْ**,
servi ejus: f. emph. **لُكْتَنَةِ**, pl.
لُكْتَنَةِ, **لُكْتَنَةِ**, juvencula;
ancilla; it. sed. c. plur. **لُكْتَنَاتِ**,
لُكْتَنَةِ, puer, juvenis;
puellae. **لُكْتَنَةِ** **لِلَّامِ** fratre
junior, minor natu. **لِيْلَهِ**
لُكْتَنَةِ minor sum quam
ut peccem. **لِيْلَهِ** **لِلَّامِ** animo
juvenilis. **لُكْتَنَةِ** **لُكْتَنَةِ** pueri
teneri.

Pa. گنک v. *den.* juvenescere
fecit; *trop.* imminuit.
Ethpa. گنکا juvenerit; *trop.*
renovatus est.
Ethpau. گنکا id.; illevit,
cfr. ar. طانی id.
گنکه نا dimin. puerulus.
گنکه هما, pl. گنکه هما, f. گنکه هما
juvenile.
پریلیس, گنکه هما puerilis, juvenilis.
پریلیا, گنکه هما pueritia, satelli-
tium.
پریلیا et گنکه هما juvenilis.
گنکه هما collectio juve-
num.
گنکه هما renovatio juventutis.
پریلیا januae vectis; calceus
ferreus *animalis*.
پریلیا et گنکه هما scopula ad
detergendas corporis sordes;
cfr. ar. طانکه هار. et pers..
گنکه هما pisciculus.

گلک - *Inus.*; cfr. ar. طانکه هما
extenuatus est.
گلکه سا tenuis, oblongus; si-
mus.
گلکه امہ tenuiter.
گلکه سا, گلکه سا tenuitas;
forma oblonga *capitis*.
گلکه هما piger, umbratilis, v. seq.

گلک - *Pa.* گلک, ar. طانکه هما,

et heb. گلک, texit, obumbravit,
operuit; tecto instruxit.
Ethpa. گلکا pass.
Aph. گلک id. q. *Pa.*
گنکه هما, گنکه هما umbra.
گنکه هما umbraticus; *trop.* figura-
tivus.
گنکه هما figurative.
گنکه هما, pl. گنکه هما umbra;
metaph. figura; spectrum.
گنکه هما et گنکه هما, f. گنکه هما et
گنکه هما, umbraculum, taber-
naculum, tentorium. pl.
گنکه هما et گنکه هما, گنکه هما et گنکه هما
in umbraculo: se-
creto.
گنکه هما qui tegit; tectum; tegu-
mentum capitis muliebre.
گلک, گلکا et گلکا, pl. گلک, tec-
tum; laquearia.
گلک, گلک et گلک, ar. طانکه هما, ros.
گنکه هما et گنکه هما roscidus.

گلک, fut. گنکه هما, ar. طانکه هما
oppressit, læsit; fraudavit,
meritam gratiam *rel* debitum
præmium negavit; male trac-
tavit, sprevit; calumniatus
est, decepit: seq. گنکه هما, finxit,
simulavit; se dissimulavit.
گلکه سا گلکه سا ingratum se
præbuit. گنکه هما گلکه هما promis-
sis non stetit.

Ethpe. لُكْمَةٌ pass.

Pa. لُكْمَهٌ id. q. *Pe.*

لُكْمَهٌ et لُكْمَهٌ injustitia ; calumnia.

لُكْمَهٌ, لُكْمَهٌ defraudator, contemptor, oppressor; injustus, infidelis, ingratus. أَوْخَا لُكْمَهٌ ager sterilis.

لُكْمَهٌ injuste.

لُكْمَهٌ, pl. لُكْمَهٌ injustitia, infidelitas; fraus; ingratus animus.

لُكْمَهٌ oppressor.

لُكْمَهٌ injustitia, calumnia.

لُكْمَهٌ, et لُكْمَهٌ panis mollis, placenta, ar. ظَانَّة.

لُكْمَهٌ, ricinus; cfr. لُكْمَهٌ.

لُكْمَهٌ talentum.

لُكْمَهٌ, pl. لُكْمَهٌ, ar. طَنْسٌ, talisma, ars magica.

لُكْمَهٌ - *Ethpe.* لُكْمَهٌ lethali sopore affectus est.

لُكْمَهٌ sopor lethalis.

لُكْمَهٌ ut لُكْمَهٌ.

لُكْمَهٌ palus; coenum.

لُكْمَهٌ ricinus seu insecta.

لُكْمَهٌ, pl. لُكْمَهٌ lens; metaph. lentigines seu maculae in facie.

لُكْمَهٌ lentigines.

لُكْمَهٌ latrunculorum ludus.

لُكْمَهٌ vectis januæ, solea jumenti; cfr. لُكْمَهٌ.

لُكْمَهٌ et لُكْمَهٌ, fut. لُكْمَهٌ defecit, consummatus est, disparuit.

Ethpe. لُكْمَهٌ id.

Pa. لُكْمَهٌ consummavit; absumpsit, dissipavit, perdidit; repudiavit, ar. طَلَقَ.

Ethpa. لُكْمَهٌ sicut *Peal.*

لُكْمَهٌ, pl. لُكْمَهٌ turma expedita, agmen. لُكْمَهٌ فَلَحَمٌ castra moverunt.

لُكْمَهٌ triumviri e tribus Isra- elitarum tribubus electi.

لُكْمَهٌ dissipatio, destructio; decrescentia lunæ vel lucis. لُكْمَهٌ فَلَحَمٌ وَسَرٌ vitæ deperditio: interitus.

لُكْمَهٌ strenuus, expeditus, peritus; cfr. ar. طَلِيقٌ et طَلِيقٌ liber, expeditus.

لُكْمَهٌ excellentia, strenuitas. لُكْمَهٌ بُشْرٌ acies ingenii.

لُكْمَهٌ placenta.

لُكْمَهٌ, مُهَدَّمٌ dissipator.

لُكْمَهٌ deficiens.

لُكْمَهٌ. pl. لُكْمَهٌ talare; sandalia.

لُكْمَهٌ sartago, hanstrum.

لُكْمَهٌ id.; perecolationis instrumentum (gall. filtre).

مُكْبَلٌ, fut. مُكْبَلٌ inquinavit, maculavit; cfr. ar. طَلَسَ, delebit, et لَنْسَ inquinatus.

Pa. مُكْبَلٌ contaminavit, scabies affectit orem; viscosum reddidit.

Ethpa. مُكْبَلٌ inquinatus est. مُكْبَلٌ et مُكْبَلٌ contaminatio.

مُكْبَلٌ litura; inquinatio.

مُكْبَلٌ viscosus, domus calce rel luto oblita.

مُكْبَلٌ viscositas.

مُكْبَلٌ contaminatio.

مُكْبَلٌ contaminatus, impurus.

امِيكُلُومٌ amiculum, toga, ar. طَيَّانٌ.

مُكْبَلٌ - *Innis in Pe.*

Pa. مُكْبَلٌ et مُكْبَلٌ verb. irreg. sic slectitur: 3^a pers. sing. f. مُكْبَلٌ et مُكْبَلٌ, pl. m. مُكْبَلٌ, f.

مُكْبَلٌ, 2^a pers. m. مُكْبَلٌ f.

مُكْبَلٌ, pl. m. مُكْبَلٌ f. مُكْبَلٌ,

1^a pers. مُكْبَلٌ, pl. c. مُكْبَلٌ; fut.

مُكْبَلٌ etc; imp. مُكْبَلٌ, f. مُكْبَلٌ,

pl. مُكْبَلٌ, f. مُكْبَلٌ polluit, contaminavit, virginem stupravit; impurum declaravit.

Part. act. et pass. مُكْبَلٌ, f.

مُكْبَلٌ.

Ethpe. مُكْبَلٌ et مُكْبَلٌ pass.

مُكْبَلٌ, emph. m. et abs. f. مُكْبَلٌ, emph. f. مُكْبَلٌ et مُكْبَلٌ, st. c. مُكْبَلٌ; pl. m. مُكْبَلٌ, مُكْبَلٌ, f. مُكْبَلٌ impurus; subst. meretrix.

مُكْبَلٌ, مُكْبَلٌ et مُكْبَلٌ, pl. مُكْبَلٌ immundities; contaminatio; in pl. execranda, nefanda.

مُكْبَلٌ immundus.

مُكْبَلٌ et مُكْبَلٌ pollutio.

مُكْبَلٌ contaminatus, impurus.

مُكْبَلٌ, ture. طَامِنَةٌ, signum principis, sigilli character.

مُكْبَلٌ ungula.

مُكْبَلٌ, fut. مُكْبَلٌ celavit, occultavit; cfr. مُكْبَلٌ.

Ethpe. مُكْبَلٌ pass.

مُكْبَلٌ occultatio.

مُكْبَلٌ ταξιστόν, fiscus.

مُكْبَلٌ et مُكْبَلٌ pelle religatus liber.

مُكْبَلٌ, fut. مُكْبَلٌ polluit; ar. طَكَنْ sanguine polluit.

Ethpe. مُكْبَلٌ pass.

Pa. مُكْبَلٌ inquinavit, omnino polluit.

مُكْبَلٌ pollutio.

مُكْبَلٌ, fut. مُكْبَلٌ obstruxit.

<i>Part. pass.</i> كُلْمَه occlusus, obturatus ; <i>adj.</i> densus, solidus ; <i>corde</i> كُلْمَه corde obcæcati ; <i>in pl.</i> loca occlusa ; <i>cfr.</i> كُلْمَه obruit.	كُلْمَه , <i>pl.</i> كُلْمَه وَمَا latebra, ar. مَطْمُوزَة .
<i>Ethpe.</i> كُلْمَه <i>pass.</i>	كُلْمَه <i>perizoma; velum capitinis.</i>
<i>Pa.</i> كُلْمَه obturavit, obstruxit ; <i>metaph.</i> cohibuit.	كُلْمَه , <i>fut.</i> كُلْمَه intinxit, immersit ; <i>cfr.</i> كُلْمَه delevit.
<i>Ethpa.</i> كُلْمَه <i>pass.</i>	<i>Ethpe.</i> كُلْمَه <i>pass.</i>
<i>Aph.</i> كُلْمَه <i>id. ac Pe.</i>	<i>Pa.</i> كُلْمَه penitus intinxit, immersit.
كُلْمَه obstructio.	كُلْمَه tinctura, immersio ; <i>pl.</i> كُلْمَه condimenta ex aceto.
كُلْمَه solide.	
كُلْمَه ore spumans.	كُلْمَه funis ; <i>pl.</i> كُلْمَه funes tentorii, <i>ar.</i> ظُبَّ.
كُلْمَه oris spumatio <i>inter loquendum.</i>	كُلْمَه tympanum ; <i>cfr.</i> <i>pers.-ar.</i> طَبَّور (gall. tambour).
كُلْمَه , <i>fut.</i> كُلْمَه abscondit, se abscondit ; inhumavit ; obruit, immersit ; irruit.	كُلْمَه , <i>pers.-ar.</i> طَبَّور, شَكِير olla, cacabus, vas.
<i>Part. pass.</i> كُلْمَه , <i>f. emph.</i>	كُلْمَه ligatus, constrictus.
كُلْمَه ; <i>subst.</i> subcinericus panis.	كُلْمَه , <i>fut.</i> كُلْمَه invidit, <i>c.</i>
<i>Ethpe.</i> كُلْمَه <i>pass. et rest.</i>	كُلْمَه <i>pers.</i> ; æmulatus est, zelo exarsit, iratus est. كُلْمَه <i>كُلْمَه</i> zelo zelatus sum Domino. <i>Part. pass.</i> كُلْمَه cui inviditur ; invidus ; <i>cfr.</i> <i>ar.</i> ظُنْ conjectavit, suspicatus est.
<i>Pa.</i> كُلْمَه obruit.	<i>Ethpe.</i> كُلْمَه zelatus est.
<i>Ethpa.</i> كُلْمَه <i>inhumatus est.</i>	<i>Pa.</i> كُلْمَه zelosum reddidit, ad zelotypiam ineitavit.
كُلْمَه occultatio, inhumatio.	<i>Ethpa.</i> كُلْمَه <i>et</i> كُلْمَه <i>pass.</i>
كُلْمَه , <i>pl.</i> كُلْمَه res abscondita, arcanum, mysterium.	zelo, æmulatione, ira concitatus est.
كُلْمَه , abstrusio, abseconsio ; perizoma, femoralia.	
كُلْمَه <i>in pl.</i> perizoma.	
كُلْمَه <i>ut كُلْمَه</i> .	

Aph. لَّا زَوْلَ inflammavit ;
ad iram provocavit. لَّا وَحْسَنْ
animum intendas.

لَّا زَلُوتِيَا zelotypia, æmulatio, invi-
dia ; indignatio.

لَّا زَلُوتَهْ zelotes.

لَّا زَلُوتَهْ cum zelo.

لَّا زَلُوتَهْ zelus, invidia.

لَّا زَلُوتَهْ id.

لَّا - *Inus. in Pe., cfr., ar.*
لَّا سَبِيْتَ suspectus, corruptus fuit.

Pa. لَّا polluit, contaminavit ;
cfr. *heb.* id.

Ethpa. لَّا لَّا pass. et refl.
لَّا , f. emph. لَّا
impurus, immundus ; pollu-
tus.

لَّا نَفْعَلْهَا , pl. لَّا نَفْعَلْهَا , pollution,
immunditia, abominatio,
inde idolum ; *in pl.* hæreses.
لَّا نَفْعَلْهَا , f. مَدْلَقْتَهْ contami-
natus.

لَّا نَفْعَلْهَا tapete, ar. طَنْسَةٌ ; cfr.
لَّا نَفْعَلْهَا et لَّا نَفْعَلْهَا .

لَّا - *Inus. cfr. طَنْسَةٌ .*

Ethpe. لَّا لَّا fœtuit.
لَّا نَفْعَلْهَا immersio.
لَّا نَفْعَلْهَا fœtidus, sordidus.
لَّا نَفْعَلْهَا , pers. تَتَكَارَ , viscus ad
usum aurificum.

لَّا مَعْلَمَ et لَّا مَعْلَمَ , pl. لَّا مَعْلَمَ , lamina,
bractea ; patera, phiala ; cfr.
pers. تَشَتَّتَ et ar. طَاسَ et
(gall. tasse).

Pa. لَّا مَعْلَمَ v. denom., in laminas
resolvit.

Ethpa. لَّا لَّا pass. et refl.
لَّا لَّا in laminas obduc-
tus.

لَّا مَعْلَمَ دُقْتَلِيْسَ ductilis.

لَّا مَعْلَمَ , pers.-ar. طَشْوَرَ , pars
dirhemī.

لَّا مَعْلَمَ tributum ; mensuræ
genus ; cfr. ar. طَسْقَةٌ et pers.
شَهْ .

لَّا مَعْلَمَ bellator.

لَّا مَعْلَمَ pugna.

لَّا, fut. لَّا هَذَا erravit, aber-
ravit, ar. طَقَى ; trop. perditus
est, periit ; trans. feffellit, ob-
litus est ; impers. لَّا لَّا vel
لَّا هَذَا fugit cum res. لَّا هَذَا
ingressus est per errorem.

لَّا هَذَا vel لَّا هَذَا a
via deflexit. لَّا هَذَا sui
immemor fuit. Part. act.

لَّا هَذَا , لَّا هَذَا , f. emph. لَّا هَذَا ,
pl. m. لَّا هَذَا , emph. لَّا هَذَا , f.
لَّا هَذَا , emph. لَّا هَذَا errans ;
planeta ; it. oblivious ; pro-
fugus, erroneous ; - subst. in pl.
emph. hæretici, impostores ;

in f. emph. errores. بَدْعَةٌ مُّهَاجِّهٌ planetæ. Part. pass. بَدْعَةٌ , بَدْعَةٌ , f. emph. بَدْعَةٌ , oblivioni datus.

Ethpe. بَلْتَجَّا لِي oblivioni datus est ; latuit, c. بَلْ pers. ; seductus est.

Aph. بَلْ in errorem induxit, c. acc. vel بَلْ aut بَلْ pers. ; perdere fecit; decepit, seduxit ; in oblivionem tradere sivit.

Ettaph. بَلْ لِي deceptor est ; oblivioni datus est. بَلْ لِي بَلْ نَوْرَةٌ حَمْدَةٌ periit ejus memoria.

بَلْ semper. in st. abs. error ; oblio ; dolus.

بَلْ بَدْعَةٌ error.

بَلْ بَدْعَةٌ dolose.

بَلْ بَدْعَةٌ error, mendum.

بَلْ بَدْعَةٌ deceptor.

بَلْ بَدْعَةٌ et بَدْعَةٌ deceptor, seductus.

بَلْ بَدْعَةٌ error, ignorantia, obli-
vio ; dolus.

بَلْ بَدْعَةٌ , f. emph. بَلْ بَدْعَةٌ in errorem inducens, fallax.

بَلْ بَدْعَةٌ بَلْ بَدْعَةٌ errantes stel-
lœ : planetæ ; subst. decep-
tor, seductor ; pl. f. بَلْ بَدْعَةٌ deceptiones. بَلْ بَدْعَةٌ بَلْ بَدْعَةٌ falsæ prophetiae.

بَلْ بَدْعَةٌ dolose.

بَلْ بَدْعَةٌ , pl. بَلْ بَدْعَةٌ error,
deceptione ; dolus.

بَلْ بَدْعَةٌ مُّهَاجِّهٌ errori obnoxius.
بَلْ بَدْعَةٌ لَا مُّهَاجِّهٌ infallibilis.

بَلْ بَدْعَةٌ , fut. بَلْ بَدْعَةٌ gustavit,
manducavit ; metaph. sensit,
expertus est. Part. pass.

بَلْ بَدْعَةٌ ; adj. sapidus ; sapiens.
it. insitus. بَلْ بَدْعَةٌ كَذَّابٌ
nihil gustavit. بَلْ بَدْعَةٌ حَمْدَةٌ no-
men honestum ; cfr. طَوْلَةٌ edit.

Ethpe. بَلْ بَدْعَةٌ pass. ; sapuit ;
insertus est surculus.

Pa. بَلْ بَدْعَةٌ gustare fecit ; surcu-
lum inseruit.

Ethpa. بَلْ بَدْعَةٌ pass. sapidum
invenit ; in ramo insitus est
surculus.

Aph. بَلْ بَدْعَةٌ gustare fecit, in-
seruit surculum ; trop. expe-
riiri fecit.

Ettaph. بَلْ بَدْعَةٌ gustatus est,
insertus est surculus.

بَلْ بَدْعَةٌ gustatio, gustus ; cibus ;
insitio, ar. ظَفَرٌ ; pl. بَلْ بَدْعَةٌ
cibi exquisiti.

بَلْ بَدْعَةٌ insertio ; surculus inser-
tus.

بَلْ بَدْعَةٌ degustatio, gustus,
sapor ; metaph. experientia,
judicium ; sensus verbi.

بَلْ بَدْعَةٌ gustans ; nutritor ; sur-
culus insitivus.

بَلْ بَدْعَةٌ degustatio, insitio.

لَحْمَنَا, f. emph. لَحْمَنَةً, pl. لَحْمَنَاتٍ sapidus, sapiens, prudens.

لَحْمَنَا, f. لَحْمَنَةً, pl. لَحْمَنَاتٍ sapidus, suavis; it. impudicus.

لَحْمَنَةً sapide, sensate.

لَحْمَنَا, pl. لَحْمَنَاتٍ sapor, maturitas; trop. sapientia.

لَحْمَانَا, pl. لَحْمَانَاتٍ et لَحْمَانَةً, pl. لَحْمَانَاتٍ gustatio, gustus; cibus; insertio; trop. sensus, affectio; aliquid pragustatum, inde specimen.

لَحْمَانَةً مَدْعَةً portio cibi, viaticum.

لَحْمَانَةً id quod gustatur, pl. f. لَحْمَانَاتٍ edulia, cibi.

لَحْمَانَةً insertio.

لَحْمَانَةً quod degustandum est, cibus.

لَحْمَانَةٌ, fut. لَحْمَانَهُ onustus fuit, tulit, portavit, sustulit, gestavit; metaph. toleravit. لَحْمَانَهُ patiens fuit. Part. pass. لَحْمَانَهُ, لَحْمَانَهُ, saepius usurp. active; emph. لَحْمَانَهُ, st. c. لَحْمَانَهُ portans etc.; adj. gravida. لَحْمَانَهُ مَهْمَهْ laborans. لَحْمَانَهُ مَهْمَهْ nuntius. لَحْمَانَهُ lancearius.

لَحْمَنَةً فَارِقاً fructifer. Zodiaeus. مَهْمَهْ مَهْمَهْ mortifera, morte digna actio. لَحْمَنَتْ مَهْمَهْ signiferi. مَهْمَهْ لَحْمَنَةً مَهْمَهْ vox significativa. أَوْهَمْ لَحْمَنَةً terra ferax; cfr. heb. نَزَّ et ar. طَنَ migravit.

Ethpe. لَحْمَانَهُ pass. حَمَّهْ حَمَّهْ portatu difficilis: vix tolerandum.

Aph. لَحْمَانَهُ oneravit; portavit; in fasciculum collegit.

Ettaph. لَحْمَانَهُ pass.

لَحْمَانَهُ, لَحْمَانَهُ et لَحْمَانَهُ onus, sareina; trop. sollicitudo, cura; c. لَحْمَانَهُ vel لَحْمَانَهُ curam suscepit, operi sese impendit. لَحْمَانَهُ لَحْمَانَهُ tuum age negotium; in f., proventus fructuum; pl. لَحْمَانَهُ.

لَحْمَانَهُ onus, portatio, pl. لَحْمَانَهُ.

لَحْمَانَهُ et لَحْمَانَهُ لَحْمَانَهُ qui portat, asportans. مَهْمَهْ مَهْمَهْ juventa sarcinaria; subst. vespilio.

لَحْمَانَهُ et لَحْمَانَهُ, pl. لَحْمَانَهُ fructificatio, fructuum productio.

لَحْمَانَهُ مَهْمَهْ quod ferri potest; tolerabilis.

لَحْمَانَهُ مَهْمَهْ tolerabilitas.

لَعْنَهُ *et لَعْنَهُ*, *fut.* لَعْنَهُ lap-sus est; erravit; defecit; *cfr. ar.* تَعْسَنَ procubuit.

Ethpe. لَعْنَهُ oblitus est; oblivioni datus est.

Aph. لَعْنَهُ in errorem induxit.

لَعْنَهُ *et لَعْنَهُ* error.

لَعْنَهُ erroneous.

لَعْنَهُ errans.

لَعْنَهُ *et لَعْنَهُ* error, divagatio. لَعْنَهُ *et لَعْنَهُ* mentis delirium.

لَعْنَهُ *error, deceptio.*

لَعْنَهُ, *fut.* لَعْنَهُ clausit; se conclusit; admovit. لَعْنَهُ

لَعْنَهُ suam mentem collegit.

Port. pass. لَعْنَهُ, *pl.* لَعْنَهُ; gramm. litteræ clausæ.

Pa. لَعْنَهُ applicuit, pressit; conjunxit, clausit; *trop.* inflxit dolorem, etc.; *ap. gram.* contraxit.

Ethpa. لَعْنَهُ *pass. et refl.*; inhaesit, adjunctus est.

لَعْنَهُ *et لَعْنَهُ* occlusio; latus, ora; basis.

لَعْنَهُ *et لَعْنَهُ* conjunctio; portæ obseratio.

لَعْنَهُ *ap. gram.* linea sub-cripta penultimæ litteræ, ad

eius accentum abbrevian-dum.

لَعْنَهُ, *fut.* لَعْنَهُ pandit, ex-tendit; *trop.* fulsit, luce coruscavit; *cfr. ar.* طَافَ exun-davit.

Pa. لَعْنَهُ extendit, dilatavit.

لَعْنَهُ extensio, expansio; ictus.

لَعْنَهُ clamor, tumultus.

لَعْنَهُ extensio.

لَعْنَهُ *et لَعْنَهُ*, *f., pl.* لَعْنَهُ tapetum, stratum.

لَعْنَهُ *inus.*; *cfr.* طَافَ pul-vere inquinatus est. *Part. pass.* لَعْنَهُ inquinatus.

Ethpe. لَعْنَهُ *pollutus est.*

Pa. لَعْنَهُ inquinavit, polluit.

Ethpa. لَعْنَهُ *pass.*

لَعْنَهُ foeditas, sordes.

لَعْنَهُ *et لَعْنَهُ* foeditas, im-munditia.

لَعْنَهُ *id.*

لَعْنَهُ contaminans, polluens.

لَعْنَهُ, *fut.* لَعْنَهُ *et لَعْنَهُ* confugit ad, auxilium petiit apud, cum σ pers., loci vel rei.

Pa. لَعْنَهُ, *v. infra s.* لَعْنَهُ.

لَعْنَهُ *et لَعْنَهُ* refugium.

لَعْنَهُ *et لَعْنَهُ*, *vide s.* قَصَّهُ.

اَدْخَلْتُكُمْ , pl. اَدْخَلْتُكُمْ τάπης , ta-pete.

اَفْعَلْتُكُمْ ^{وَ} τύπος , pl. اَفْعَلْتُكُمْ , typus, figura ; exemplum, exemplar ; modus ; apud gramm. forma. اَمْ اَفْعَلْتُكُمْ prototypus. — adverb. حَدَّهُ عَصْمًا , ad instar.

اَفْعَنْتُكُمْ figurate. اَفْعَنْتُكُمْ typicus, mysticus ; apud gramm. adjectivum.

Pa. اَفْعَلْتُكُمْ v. denomin. a اَفْعَلْتُكُمْ figuravit, significavit.

Ethpa. اَفْعَلْتُكُمْ pass. - ; assimilatus est, c. حَدَّهُ عَصْمًا .

اَدْعَمْتُكُمْ adumbratio, figuratio. اَمْحَمْتُكُمْ , f. emph. اَمْحَمْتُكُمْ , typicus ; repræsentativus.

اَعْمَلْتُكُمْ ut اَفْعَلْتُكُمْ . اَعْمَلْتُكُمْ locus, gr. τόπος ; edictum, scopus, figura, typus, gr. τόπος .

اَفْعَلْتُكُمْ crepitavit lucerna moriens ; ad occasum declinavit sol. Part. præs. اَفْعَلْتُكُمْ fu-migans.

Ethpalp. اَفْعَلْتُكُمْ pass. ; strepuit aqua, crepitavit lucerna.

اَفْعَلْتُكُمْ crepitatio. اَفْعَلْتُكُمْ panis tenuis ; cfr. حَمْمًا .

اَفْعَلْتُكُمْ , heb. גְּזֵזָה , ar. ظَفَرٌ , unguis.

اَفْعَنْتُكُمْ f. unguis ; ungula ; onyx. مُنْعَثَا وَقَنْدَا a teneris unguiculis.

اَفْعَنْتُكُمْ - Inus. ; cfr. ar. طَفِيسْ sor-didus fuit.

اَفْعَنْتُكُمْ immundities, sordes. اَفْعَنْتُكُمْ veru.

اَفْعَنْتُكُمْ et اَفْعَنْتُكُمْ desertum, soli-tudo ; falco.

اَفْعَنْتُكُمْ اَفْعَنْتُكُمْ deceptor, seductor.

اَفْعَلْتُكُمْ τακτόν , mensura, por-tio.

اَفْعَلْتُكُمْ et اَفْعَلْتُكُمْ , ar. طَرَأْ , impul-sit, offendit, allisit, abegit, percussit, plerumque c. حَدَّهُ عَصْمًا vel اَفْعَلْتُكُمْ objecti, inde incurrit, ir-ruit ; illevit, dealbavit. Part. pass. اَفْعَلْتُكُمْ , لِمَنْ ; subst. a dæ-mone vexatus.

Ethpe. اَفْعَلْتُكُمْ pass. ; allisit, ir-ruit, commovit, offendit, sæpe c. حَدَّهُ عَصْمًا vel اَفْعَلْتُكُمْ rei.

Pa. اَفْعَلْتُكُمْ repulit, percussit.

Ethpa. اَفْعَلْتُكُمْ irrit. اَفْعَلْتُكُمْ , لِمَنْ impulsio, allisio ; li-tura.

اَفْعَلْتُكُمْ litura ; it. discus, sporta, pers. جَزِيَانْ .

اَفْعَلْتُكُمْ مُهَمَّتُكُمْ contradic-tio ; expul-sio.

مُوْنَجْ recens, humidus ; cfr. ar.

سَرِيٰ . et heb. سَرِيٰ .

نَفْ imper. verb. نَفْ .

نَفْ تَبْرَثَةٌ , turba.

لَعْنَهْ perturbavit.

لَعْنَهْ لَهْ وَحْلَهْ festinatio ; perturbatio.

لَعْنَهْ et لَعْنَهْ , v. s. لَعْنَهْ .

لَعْنَهْ pers. - ar. تُرْبَدْ turpe-
thum planta, seu purgantis
radicis indicæ nomen.

لَعْنَهْ et لَعْنَهْ تَرْجِيْمَهْ ,
tragœdus, cantor, f. لَعْنَهْ
cantatrix.

لَعْنَهْ , id. q. لَعْنَهْ , malum
citreum ; cfr. ar. تُرْجِيْمَهْ .

لَعْنَهْ laxis labiis præditus.

لَعْنَهْ , pers. شَرَهْ , thos (gall.
chacal).

لَعْنَهْ , fut. لَعْنَهْ expulit, abe-
git ; stimulavit equum ; ar.
طَرَدْ . Part. pass. لَعْنَهْ , بَرْجَهْ
ejectus ; adj. exsul.

Ethpe. لَعْنَهْ pass.

Pa. لَعْنَهْ id. q. Pe.

Ethpa. لَعْنَهْ expulsus est.

لَعْنَهْ actus impellendi ; expulsio.

لَعْنَهْ et لَعْنَهْ expulsio.

لَعْنَهْ expellens , depulsor.

لَعْنَهْ et لَعْنَهْ strabo.

لَعْنَهْ strabismus.

لَعْنَهْ frigidus ; strabo.

لَعْنَهْ strabismus.

لَعْنَهْ تَرْجِيْمَهْ تَرْجِيْمَهْ , solanum
nigrum.

لَعْنَهْ , pl. لَعْنَهْ trulla.

لَعْنَهْ تَرْجِيْمَهْ , vulnus.

لَعْنَهْ تَرْجِيْمَهْ تَرْجِيْمَهْ , tyrannus ; trop.
crudelis.

لَعْنَهْ tyrannice.

لَعْنَهْ tyrannis ; crudelitas,
rebellio.

لَعْنَهْ tyrannicus ; crudelis.

لَعْنَهْ eibus, v. s. لَعْنَهْ .

لَعْنَهْ تَرْجِيْمَهْ تَرْجِيْمَهْ , solstitium,
tropicus.

لَعْنَهْ tropicus, tropicalis.

لَعْنَهْ murmuravit.

لَعْنَهْ تَرْجِيْمَهْ murmuratio.

لَعْنَهْ crepitum ventris emi-
sit.

لَعْنَهْ crepitus ventris.

لَعْنَهْ ebullivit olla.

Ethpa. لَعْنَهْ ad ebullitionem
ductus est ; metaph. æstuavit,
agitatus est.

لَعْنَهْ ebullitio ; agitatio.

لَعْنَهْ gemitus, ululatio.

لَعْنَهْ , لَعْنَهْ craticula, sar-
tago ; cfr. لَعْنَهْ .

۴۶۱ پانیس *panis* in sartagine
coctus.

۴۶۲ ایدی *id. q. مهندی*.

۴۶۳ ایم *v. s. مهندی*.

۴۶۴ تریون *: it. مهندی*, *pl.*

vox lat. tribunus.

۴۶۵ ایم *officium tribuni.*

۴۶۶ تریون *, pl. مهندی*, *et*

مهندی, *pl. مهندی*,

مهندی *تریونوں*, triangulum.

۴۶۷ تریون *triangularis.*

۴۶۸ مهندی *تریوس*, tertius.

۴۶۹ تریون *et مهندی* *تریون*, tertia
indictio.

۴۷۰ تریون *تریاتیوس*, tertiana
febris.

۴۷۱ مهندی *dimidium drachmæ.*

۴۷۲ مهندی *تریکومونیس*, capparis
planta.

۴۷۳ مهندی *pirus communis.*

۴۷۴ مهندی *تریس*, tres.

۴۷۵ مهندی *تریستاتیوس*, ter-
tius miles, essedarius.

۴۷۶ مهندی *لیگولا* coriacea ad
ocreæ calcem ligandam.

۴۷۷ مهندی *تریکاکلیناتی*,
indictio decima tertia.

۴۷۸ مهندی *تریکلینیس*, cui
tres sunt gradus.

۴۷۹ مهندی *tripodes*, balistæ.

۴۸۰ مهندی *تریوللوں*, trifolium
herba, lotus.

۴۸۱ تریتیا *تریتیا*, Tritheitæ.

۴۸۲ تارخی *تارخی*, calumniatio.

۴۸۳ تارخی *calumniator*, dolosus; *per*
antonom. Satan.

۴۸۴ تارخی *dolose.*

۴۸۵ تارخی *perfidia, nequitia, per-
turbatio.*

۴۸۶ پتیسا *پتیسا*.

۴۸۷ تراخیلوس *تراخیلوس*, collum.

۴۸۸ تاریخی *تاریخی*, *et تاریخی*
تراویلوس, endivium (*gall.*
chieorée).

۴۸۹ تاریخی *et تاریخی* *massa*,

subcinericus panis; *cfr. ar.*

۴۹۰ تاریخی *تریموس* *et it. syr. مهندی*.

۴۹۱ تاریخی *هیرمی*, aestus, febris.

۴۹۲ تاریخی *تریپنیوں*, tertia pars
aurei.

۴۹۳ تاریخی *pl. تاریخی* solea
caleei.

۴۹۴ تاریخی *adhib. in pl.*, althæa.

۴۹۵ تاریخی *inquinavit*; *cfr. مهندی*.

۴۹۶ تاریخی *pl. مهندی* obolus.

۴۹۷ تاریخی *تاریخی*, series lapi-
dum in muro prominens.

۴۹۸ تاریخی *fut. مهندی* pereussit, *c.*

۴۹۹ تاریخی *vel تاریخی rei*, concussit.

۵۰۰ تاریخی *pluries pereussit*, ex-
cussit; *inspexit*; *trop. afflxit*, *exagitavit*; *- denom.*

دُرُس, دُرُس et دُرُس durus.

دُرُس id.

دُرُس durities.

دُرُس induratio.

مَعْلُوٌ, fut. مَعْلُوٌ sparsit,
conspersit; maculavit.

Pa. مَعْلُوٌ allisit, maculavit.

Ethpa. مَعْلُوٌ pass.

Palp. مَعْلُوٌ inquinavit; trop.
inscite descripsit.

Ethpalp. مَعْلُوٌ inquinatus
est.

لَاقٌ lac acidum.

لَاقٌ et لَاقٌ quercus sterilis.

لَاقٌ exagitatio, vexatio; in-
quinatio; cibus. inquinatus,
i. e. vetitus in tempore je-
junii, ut caro, lac.

لَاقٌ et لَاقٌ, fut. لَاقٌ latuit,
se abscondit. Part. præs. لَاقٌ
latens. Part. præt. لَاقٌ,
لَاقٌ abscinditus, occultus;
pl. f. لَاقٌ occulta, abditi
thesauri.

Pa. لَاقٌ abscondit, celavit;

prætexuit. Part. act. مَعْلُوٌ
celans. Part. pass. مَعْلُوٌ,
مَعْلُوماً, f. emph. مَعْلُوٌ, pl.
m. مَعْلُوٌ, emph. مَعْلُوٌ, f.
مَعْلُوٌ مَعْلُوماً مَعْلُوماً abscinditus,
occultus; apocryphus; - subst.
in pl. f. secreta; thesauri.

Ethpa. مَعْلُوٌ pass. et refl.

Aph. مَعْلُوٌ abscondit. Part.
pass. مَعْلُوٌ, مَعْلُوٌ; pl.
مَعْلُوٌ loca abdita, latebrae.

لَهْلَهٌ, abseconsio, occultatio;
latebra. مَعْلُوٌ et in st. abs.
لَهْلَهٌ clam, secreto.

لَهْلَهٌ id. q. لَهْلَهٌ.

لَهْلَهٌ latibulum.

لَهْلَهٌ absconsio.

لَهْلَهٌ secreto.

لَهْلَهٌ et لَهْلَهٌ abscon-
sio.

لَهْلَهٌ f. emph. لَهْلَهٌ لَهْلَهٌ littera
abscinda seu assimili-
lita.

لَهْلَهٌ, fut. لَهْلَهٌ id. q. لَهْلَهٌ
linivit, v. s. لَهْلَهٌ.

لَهْلَهٌ stella Veneris, al. cons-
tellatio Orionis.

مـ

ـ seu مـ decima littera alphabeti Syrorum. Una est ex tribus semivocalibus: لـ, ئـ, مـ. Numerice valet : ـ vel ئـ = 10, بـ = 100, مـ = decimus, etc. Respondet tum heb. يـت بـهـ, et ar. حـدـاـ, حـدـاـ, ئـتـ, ئـتـ, رـأـسـ, رـأـسـ, tum ar. وـكـ, وـكـ : وـ. In pronunciatione, quando finalis est, tacet: حـدـ, liber meus; مـهـ (f.), surge.

ـ et مـ interj. ô ! heu !
o fili mi ! : cfr. ar. يـ وـ .
ـ vel مـاـ, f. emph. مـاـ ;
pl. m. مـاـ, f. emph. مـاـ ;
ـ pulcher, decorus, honestus ; decens, conveniens ; decent. مـاـ te decet pro يـهـ ;
ـ pro مـاـ يـهـ ; cfr. heb. حـاـ مـاـ حـسـاـ ; رـأـحـاـ - رـأـحـاـ ;
ـ hymnus. رـكـاـ مـاـ ئـتـ aptae orationes.
ـ pulchritudo, decor, elegantia.

مـلـات, fut. مـلـات, cupivit, concupivit, inusit. ; cfr. heb. אַבְהָא et מـلـات, ar. أـبـ. Part. act. مـلـات, pl. مـلـات, مـلـات appetens, desiderans. Part. pass. مـلـات, مـلـات, f. emph. مـلـات, pl. m. مـلـات, f. مـلـات cupiens, cupidus. أـعـفـعـاـ مـلـات fervens deprecatio.

Pa. مـلـات id. Part. pass. مـلـات desiderio captus.

Ethpa. مـلـات, et مـلـات vel مـلـات et مـلـات appetiit, desideravit.

ـ مـلـات cupide.

ـ مـلـات, cupiditas, desiderium.

ـ مـلـات desiderium.

ـ مـلـات optativus.

ـ مـلـات appetitivus.

ـ مـلـات id.; gramm. optativus.

ـ مـلـات et مـلـات vel

ـ مـلـات appetentia, cupido.

ـ مـلـات avide.

ـ مـلـات, ar. يـاسـيـنـ, jasminum.

ـ مـلـات pistor, id. q. أـفـاـ .

Pa. مـلـات clangorem

edidit, clamavit, cecinit ; ululavit ; *cfr.* حَمَّدٌ حَمَّدَهُ - حَمَّدٌ حَمَّدَهُ cornu cecinit.

مَحَّدٌ clangor tubæ; vocifratio ; jubilatio.

مَحْمَسٌ c., ḥ̄βη, pubertas, puer ; it. ᬁβις, ibis avis.

مَحَّ - *cfr. ar.* وَبَنْ, fluxit.

مَحَّ defluere fecit, *inde* duxit, deduxit, *in ordine* fecit, exceptit ; transmisit ; perduxit, transtulit *librum*.

Ethpa. مَحَّا ductus, deductus, transmissus est ; ortus est ; processit, propagatus est ; translatus est.

Aph. مَحَّا duxit, perduxit, abduxit ; obtulit ; protulit, exceptit.

Ettaph. مَحَّا ductus est, deductus est, translatus est, propagatus est.

مَحَّا, حَلَّا, rivus ; alga ; مَحَّا, بِعْدًا lentiscus ; junci species.

مَحَّا, مَحَّلا, مَحَّلا, pl. مَحَّلا series, ordo, successio, chronologia ; genus, gens ; jus successionis ; traditio ; translation, propagatio ; epocha. مَحَّا

أَهْنَا æra, chronologia.

مَحَّا genealogicus ; genitalis ;

مَيْلًا وَمَحَّكَتْرًا annus jubilæi ; *it.* etymologus ; traditionarius.

مَحَّكَتْرًا qui transmittit *vel* commutat, *inde* tabellarius, mercator ; successor ; translator.

مَحَّكَتْرًا successio, traditio.

مَدَكَتْرًا deductus ; *ap. gramm.* derivatum *nomen*.

مَهْدَكَتْرًا abductio.

مَهْدَكَتْرًا f., pl. مَهْدَكَتْرًا onus, sarcina. مَهْدَكَتْرًا onus meum.

مَهْدَكَتْرًا dux, ductor.

مَهْدَكَتْرًا adductio ; deductio.

مَهْدَكَتْرًا abductio.

مَهْدَكَتْرًا nomen venti.

مَهْدَكَتْرًا, heb. יְבֵדָה, levir.

مَهْدَكَتْرًا, st. c. مَهْدَكَتْرًا heb. יְבֵדָה uxor leviri ; fratria.

Pa. مَهْدَكَتْرًا v. *denom.*, fratris mortui uxorem duxit.

مَهْدَكَتْرًا leviratus.

مَهْدَكَتْرًا otis tarda, (*gall.* outarde).

مَهْدَكَتْرًا mandragora, (*compos.* ex مَهْدَكَتْرًا et مَهْدَكَتْرًا, quod dat animum, aphrodisiacus), *ar.* يَنْزُورَهُ .

مَهْدَكَتْرًا

أَهْنَسَ مَهْدَكَتْرًا, *ar.* يَئِسَ, *nnq.* fut. أَهْنَسَ مَهْدَكَتْرًا arefactus est, aruit, emarcuit.

Pa. مَهْدَكَتْرًا arefecit, marcescere sivit.

Ethpa. مُحَمَّدٌ pass.

Aph. **حَصَّةٌ** *id. q. Pa.*; *denom.*
in terram aridam convertit.
حَصَّةٌ *aridum, terra continens;*
buteo avis (gall. buse).

جَمِيع *terrestris.*

جَفَافٌ siccitas.

جَمِيعٌ siccus, terrestris.

مَحْمَداً, f. **مَحْمِداً** siccus, aridus ;
mareens ; - subst. in fem. ter-
ra arida, continens.

الجفاف siccitas.

مَحْمَدٌ siccandi vim habens,
exsiccans.

جفونه exsiccatio.

L. *in usit.* in *Po.*

Aph. **أَبْجِدْ** abegit, removit,
ejecit; *cfr.* **أَزْجَأْ** expulit, dimo-
vit.

H. s. avertens.

Ex- expulsio, aversio.

*l'ol profunda rei disquisitio,
luctus, cfr. l'or et l'et.*

i — Schaph. *i* project, expulit.

Ettaph. ~~is~~ ^{oñal} pass.

acervus lapidum, tumulus funeralis, agger; cfr. heb. זבָן congregavit.

 abjectio ; projectio.

مَهْمَة, f. **مَهْمَة** qui mit-

titur; subst. epistola (*gall.*
missive).

 inusit. in Pe.

Aph. **בָּפְתַּח** cfr. heb. הִנְחָה (*Hiph.*
 a *הִנְחָה*) confessus est; profes-
 sus est, credidit, c. **וְ**, **וְ**
et sc̄epius **וְ** *rei*; attribuit,
 c. **וְ** *et acc.*; gratias egit,
 laudavit, c. **וְ**. *Part. act.*
מְהֻמָּדָה, *pl.* **מְהֻמָּדָה** *vel*
מְהֻמָּדָה *אֵין* confiteor ego.

Ettaph. ፩፻፻፻ agnitus est,
creditus est, aestimatus est,
prædicatus est.

Schaph. شاف inus.

Eschta ph. የዕስና—*i* promisit;
confessus est, consensit; *it.*
c. እና convenit cum, pactum
iniit.

مَوْعِدٌ *vel* **مَوْعِدٌ** promissio;
indicatio; *ap. gramm.* pro-
positio antecedens.

وَمَنْ confitens, Confessor *fidei*;
gratias agens, beneficii me-
mor.

۷۰۰،۷۰۱،۷۰۲ confessionis more.

الْمَهْدَى وَمُتَّهِى confessio, professio,
inde martyrium; fides, sym-
bolum fidei; gratiarum ac-
tio.

مَدْعُونٌ confessus, pro vero
agnitus, certus.

مَهْدَاهُوْمَتْنَاهُ manifeste.

مَهْدَاهُوْمَتْنَاهُ professio fidei.

مَهْدَاهُوْمَتْنَاهُ confessus, promissus.

مَهْدَاهُوْمَتْنَاهُ promissio.

مَهْدَاهُوْمَتْنَاهُ , pl. مَهْدَاهُوْمَتْنَاهُ ,
confessio, professio fidei; confessio peccatorum; gratiarum actio, *inde* Eucharistia; religio, fides; secta;
مَهْدَاهُوْمَتْنَاهُ confessione rectus: orthodoxus.

مَهْدَاهُوْمَتْنَاهُ ad fidem pertinens; memor beneficii.

أَمْبَا , cfr. heb. יְהָ ו ar. يَدْ ,
st. c. يَدْ , et يَدْ spec. in sensu
trop., pl. أَمْبَاتْ , أَمْبَاتْ ,
et يَدْ spec. in sens. trop.,
st. c. يَدْ manus, pes anterior
quadrupedis; trop. manubrium, axis rotæ; brachium
sedilis, brachiale, manicæ; ri-
pa, littus; manuum impositio,
inde ordinatio; potestas, libe-
ralitas, mediatio; opportuni-
tas, pler. c. يَدْ ; يَدْ
manus magna: superbia, po-
tentia; c. præp. يَدْ , per, me-
dio, ope, propter; يَدْ eum occidit gladio.
يَدْ اكْدَاهُ مَقْصَمْ per tres dies.
يَدْ حَابَاهُ larga manu; يَدْ
nostris manibus: ope

nostra. حَلَّهُ أَتَبْ per me; it.
adv. حَابَاهَا deinceps, حَلَّهُ مَفْعَلْ juxta, prope. حَلَّهُ مَفْعَلْ ad littus maris. حَابَاهَا حَابَاهَا ordine, sensim, deinceps, suc-
cessive, ex parte; أَبَاهَا حَابَاهَا singuli, paulatim; حَلَّهُ vel حَلَّهُ , حَلَّهُ , حَلَّهُ , propterea
quod; مَنْهُ أَتَبْ مَنْهُ حَفْتَنَا prop-
terea. مَبْهَهُ أَبَاهَا ad manum, coram, palam. حَنَّ أَبَاهَا pugio; saxum manum implens.

حَلَّهُ denomin. a حَلَّ conforta-
tus est. حَلَّهُ حَلَّهُ حَلَّهُ surge
et esto robusta.

مَبْهَهُ upupa; al. millipeda.
مَبْهَهُ et مَبْهَهُ مَبْهَهُ مَبْهَهُ مَبْهَهُ mentha.

حَلَّهُ ; cfr. heb. יְדָה et ar. يَدْ amavit.

Pa. يَدْ amavit, dilexit.

Ethpa. يَدْ pass.

مَبْهَهُ ، مَبْهَهُ amatus, dilectus; amicus.

مَبْهَهُ amicitia, dilectio.

مَبْهَهُ c. et مَبْهَهُ f. hyæna.

حَلَّهُ , et nnq. حَلَّهُ , fut.
ثَبَهُ , imper. حَلَّهُ , cognovit;
scivit, agnovit, intellexit;
seq. حَلَّهُ didicit, certior factus
est; seq. نَعْمَهُ vel حَوْنَاهُ , ad se

rediit, mentis suæ compos factus est; seq. **pers.** et **acc.** *rei* curavit, rationem exegit. **نَعْرِفُ** وَ **نَعْرِفُ** nosce teipsum. **وَنَعْرِفُ** **سَبِيلًا** sui compos fuit. **وَنَعْرِفُ** **مَبْرُوكًا** **لِّا** animo defectus est. *Part. act.* **مَبْرُوكًا**, **مَبْحَارًا** cognoscens, expertus; peritus. **مَبْحَارًا** *i. q.* **لِّي** **مَبْرُوكًا** scio; **لِّي** **مَبْحَارًا** **لِّا** nescio; nequeo. **مَبْحَارًا** **لِّا** scias **مَبْحَارًا** **لِّا** *tu scis*: profecto, sane. **مَبْحَارًا** **مَهْمَامًا** syri sermonis gnarus. **مَبْحَارًا** legisperiti. **مَبْحَارًا** sapientes. *Part. pass.* **مَبْحَارًا**, **مَبْحَارًا** *et مَبْحَارًا*, *f.* *emphat.* **مَبْحَارًا**; *adject.* celebris, insignis; notabilis, amplus; determinatus, specialis, certus. **مَبْحَارًا** **مَبْرُوكًا** præclara domus. **مَبْحَارًا** **مَبْرُوكًا** optimates civitatis. **مَبْحَارًا** **مَبْرُوكًا** certi anni. **مَبْحَارًا** certum est; **مَبْحَارًا** scilicet.

Ethpe. **مَبْرُوكًا** *pass.*; *it.* designatus est, cognominatus est, floruit; *impers.* **مَبْحَارًا** notum est. **مَبْحَارًا** *id.*

Pa. **مَبْرُوكًا** edocuit, ostendit, indicavit.

Aph. **مَبْرُوكًا** scire fecit, indicavit, renuntiavit, certiorem fecit; edocuit, *c. acc. p.* et *rei*; *c.*

مَبْرُوكًا pers. detulit aliquem.

Ettaph. **مَبْرُوكًا** notus factus est.

Schap. **مَبْرُوكًا** indicavit, significavit; mentionem fecit, *c.* **مَبْرُوكًا**; manifestavit, prædictit; cognovit.

Eschaph. **مَبْرُوكًا** novit, cognovit, intellexit.

مَبْحَارًا, **مَبْحَارًا** nota, signum.

مَبْحَارًا *et مَبْحَارًا* cicendela (*gall. ver-luisant*).

مَبْحَارًا *et مَبْحَارًا* clare, manifeste; nominativum.

مَبْحَارًا, *nnq.* **مَبْحَارًا**, *pl.* **مَبْحَارًا**, **مَبْحَارًا**, **مَبْحَارًا**, cognitio, scientia, signum, indicium. **مَبْحَارًا** **مَبْحَارًا** viri docti; **مَبْحَارًا** **لِّا** ignorantia; **مَبْحَارًا** **لِّا** **مَبْحَارًا** imprudenter, sine reflexione.

مَبْحَارًا sciens, intelligens; doctus, peritus; cognitor, visiones videns, hariolus; notus, familiaris.

مَبْحَارًا, *pl.* **مَبْحَارًا** hariolus.

مَبْحَارًا **مَبْحَارًا** divinatio; cognitio; **مَبْحَارًا** **لِّا** ignorantia.

مَبْحَارًا **مَبْحَارًا** perdoctus, sapiens; rationalis.

مَبْحَارًا **مَبْحَارًا** sapienter, docte.

مَبْحَارًا **مَبْحَارًا** scientia.

مَبْحَارًا **مَبْحَارًا** cognitio, manifestatio; *ap. gramm.* determinatio.

مَبْحَارًا **مَبْحَارًا** intellectus, scientia,

conscientia ; c. aff. 1^o pers. مَهْدِيٌّ, vel مَهْدِيٌّ.

عَلَيْهِ مَهْدِيٌّ verb. denom., mente dota-
vit.

Ethpa. عَلَيْهِ مَهْدِيٌّ pass. ; notitiam
habuit, intellexit.

عَلَيْهِ مَهْدِيٌّ intelligentia
præditus, doctus ; mentalis.

عَلَيْهِ مَهْدِيٌّ scientia.

عَلَيْهِ مَهْدِيٌّ f. emph. edocens, notificans ; signum
dans, *inde subst.* tintinnabu-
lum.

عَلَيْهِ مَهْدِيٌّ notificatio.

عَلَيْهِ مَهْدِيٌّ scientia, notitia ;
familiaris, notus ; pl. عَلَيْهِ مَهْدِيٌّ noti, familiares. فَكُلُّ مَهْدِيٍّ talis est ex notis meis.

عَلَيْهِ مَهْدِيٌّ mente perceptus ;
spiritualis.

عَلَيْهِ مَهْدِيٌّ metaphorice ; typee.

عَلَيْهِ مَهْدِيٌّ cognitio, notificatio.

عَلَيْهِ مَهْدِيٌّ rel. عَلَيْهِ مَهْدِيٌّ significatio,
indicatio, notitia ; signum ;
catalogus, index ; ap. gramm.
connexio subjectum inter et
prædicatum, prædicatum ip-
sum, (*id. q. ar.* خَبَرْ).

عَلَيْهِ مَهْدِيٌّ demonstrativus.

عَلَيْهِ مَهْدِيٌّ significans.

عَلَيْهِ مَهْدِيٌّ significatio.

عَلَيْهِ مَهْدِيٌّ cognitus ; act. agnos-
cens, cognoscens, notificans.

عَلَيْهِ مَهْدِيٌّ cognitio ; notifica-
tio.

عَلَى رِه, forma poetica et de-
curetata nominis Dei in lin-
gu hebraica pro رَحْمَةٌ.

عَلَى id. q. لَمْ, ô ! heu ! ; it. satis
est.

عَلَى

عَلَى ar. وَهَبْ , poet. et ple-
rumque عَلَى c. or quiese.,
quod sic flectitur in præt. 3^a
pers. sing. f. عَلَى, m. pl. عَلَى,
f. مَهْدِيٌّ vei عَلَى ; 2^a pers.
s. m. عَلَى ; 1^a pers. sing.
عَلَى ; pl. عَلَى, fut. irreg. عَلَى
pro inusit. عَلَى , imper. عَلَى,
pl. عَلَى etc., inf. عَلَى , raro
عَلَى . Part. act. عَلَى , عَلَى .
Part. pass. عَلَى , عَلَى ,
dedit ; tradidit, obtulit, con-
cessit ; tribuit, attribuit,
permisit ; posuit, collocavit,
constituit ; perfecit ; c. عَلَى
irruit, congressus est, cepit ;
pænam imposuit. عَلَى أَمْبَاءٍ
victas manus dedit ; cessit,
concessit ; it. auxiliatus est.
عَلَى مَهْدِيٌّ locum dedit : per-
mitit عَلَى مَهْدِيٌّ sententiam
tulit. عَلَى مَهْدِيٌّ beatificavit.
عَلَى مَهْدِيٌّ dexteram dedit
ad pactum confirmandum

مَيْتَ odore flagravit.
 مَكْدُلَةً vel قَدْرَةً مَيْتَ res-
 ponsum dedit; « مَيْتَ se
 obtulit, devovit. مَيْتَ مَكْدُلَةً
 finem fecit, finivit. مَيْتَ مَكْدُلَةً
 valedixit; osculum dedit. مَيْتَ

دَكْرَةً eos aggressus est.
 مَكْدُلَةً مَيْتَ pœnas luit.
 مَيْتَ وَهُرَّاً remedium tulit. تَه
 age! eia! لَهْ حَسْبَ وَدَحْتَرَةً pone
 me fecisse. تَهْ مَيْتَ in eo
 fuit ut scriberet. مَيْتَ وَنَصَّ
 fugere coeperunt. مَيْتَ نَعْدَا
 bibendum ei dedit. مَيْتَ

أَوْتَرَةً مَنْ دَهْ دَهْ ex dono Dei lu-
 men viderunt.

Ethpe. تَهْلَكَلَةً pass.

مَادَرَةً, f. مَادَرَةً dator, largi-
 tor; *ap. gramm.* *dativus.*
 مَكْدُلَةً donatio, largitio;
 actio dandi. تَهْ لَهْ مَهْ
 legislatio. مَادَرَةً مَهْ مَهْ
 mutuum et commodum.

لَهْ لَهْ nng. لَهْ لَهْ id. q.
 لَهْ لَهْ أَبْرَاهِيمْ præstola-
 tio auxilii. سَرْ لَهْ لَهْ fuga.
 لَهْ لَهْ لَهْ licentia. لَهْ لَهْ لَهْ
 sortitio. مَهْ مَهْ مَهْ
 partitio agrorum militibus.

مَهْ مَهْ in dativo casu.

مَهْ مَهْ donatio.

مَهْ مَهْ et مَهْ مَهْ st. c.
 مَهْ مَهْ pl. مَهْ مَهْ donum,

munus, gratia; *adv. in st. c.*
 مَهْ مَهْ gratis.
 مَهْ مَهْ donatus.
 مَهْ مَهْ donatio.
 مَهْ مَهْ in dativo casu.

وَهْ مَيْنَسْ minus recte pro وَهْ q.
 vid. Part. pass. مَهْ مَهْ; adj.
 memorabilis, pl. مَهْ مَهْ
 præclara facta.

وَهْ partic. indicans commina-
 tionem et exultationem, væ!
 وَهْ id. q. وَهْ divinum No-
 men.

وَهْ vel وَهْ, وَهْ, c., pl.
 وَهْ cohors, turma; exer-
 citus.

سَقَاءً مَهْ كُلْتَهً gregarius.
 animalia gregalia.

وَهْ littera decima alphabeti;
 pl. وَهْ apices.

وَهْ parvulus, pl. وَهْ.

وَهْ ad litteram ioud perti-
 nens, per ioud scriptus.

وَهْ vel وَهْ pardus.

وَهْ dim. voc. وَهْ, parvum
 iota.

وَهْ مَهْ مَهْ m., pl. مَهْ مَهْ,
 مَهْ مَهْ, st. c. مَهْ مَهْ
 مَهْ مَهْ dies; مَهْ مَهْ وَهْ مَهْ
 وَهْ مَهْ, feria secunda,

tertia, quarta, etc. **وَمَهْتَأ** sabbatum. **وَمَهْنَتَأ** dies Dominica. **وَمَهْنَتَأ** novissimus, *seu* judicii dies. **مَهْنَتَأ** *id.*; **مَهْنَتَأ** *vel* **وَمَهْنَتَأ** *id.* **مَهْنَتَأ** *vel* **مَهْنَتَأ** *it.* **مَهْنَتَأ** *vel* **مَهْنَتَأ** hebdomada. **مَهْنَتَأ** *vel* **مَهْنَتَأ** mensis plenus; *it.* tempus, epocha; *trop.* regnum. **حَةَنَتَأ** وَمَهْنَتَأ sub regno Davidis. **حَتَّلَا** وَمَهْنَتَأ Chronica, Paralipomena; *adv.* **حَنَنَتَأ** *et* **مَهْنَتَأ** ipso die, eo ipso die, *vel* statim; *adj.* ephemeris, uno eodemque die productus *vel* perfectus; **مَهْنَتَأ** aliquandiu. **حَيَّلَا** **مَهْنَتَأ** totus annus; **حَيَّلَا** **مَهْنَتَأ** annus plenus. **مَهْنَتَأ** *et* **حَنَنَتَأ** diebus singularibus. **حَنَنَتَأ** *et* **مَهْنَتَأ** in dies. **مَهْنَتَأ** quadam die. **حَبَّنَتَأ** **حَسَنَتَأ** **حَدَّنَتَأ** usque in aeternum. **مَهْنَتَأ** *heri*, nuper. **فَبَهْنَتَأ** **مَهْنَتَأ** nuper. **بَقِيَّتَأ** **مَهْنَتَأ** in suis diebus *seu* in sua vita. **تَهْنَتَأ** لَا اَحَدُؤُمْ *per* dies multos. **مَهْنَتَأ** *in* die qua. **وَهْنَتَأ** **حَنَنَتَأ** apud unum quemque vicissim.

مَهْنَتَأ, *ar.* الْيَوْم, *contr.* **a** **مَهْنَتَأ** *et* **مَهْنَتَأ** *hodie*, hic dies, *hoc tempus*; **مَهْنَتَأ** **وَمَهْنَتَأ**.

hodierna dies; præsens tempus.

مَهْنَتَأ hodiernus.

أَمَهْنَتَأ *c. l prostheth.*, *pl.* **أَمَهْنَتَأ** *dies, opp.* nocti. **مَهْنَتَأ** وَ**أَمَهْنَتَأ** horæ diurnæ *Officii*. **كَهْنَتَأ** **أَمَهْنَتَأ** *nocte et die*; **كَهْنَتَأ** *id.* **أَمَهْنَتَأ** diurnus, hodiernus.

مَهْنَتَأ *c.*, columba, *c. suff.* 1^æ pers. **مَهْنَتَأ**.

مَهْنَتَأ columbinus.

مَهْنَتَأ, *fem.* **مَهْنَتَأ**, *pl.* Græci. **عَيَّلَا** وَمَهْنَتَأ æra Seleucidarum. *i. e.* 311 *ante Christum*.

مَهْنَتَأ *v. denom.*, more Græcorum fecit; græce locutus est *vel* scripsit.

Ethpa. **أَمَهْنَتَأ** græcus factus est; græcam linguam didicit.

مَهْنَتَأ Græcitas *seu* gentilitas, paganismus; lingua græca.

مَهْنَتَأ græce.

مَهْنَتَأ *لِوَأ*, viola.

مَهْنَتَأ vox lat., justus.

مَهْنَتَأ, *v. s.* مَهْنَتَأ.

مَهْنَتَأ *et* **مَهْنَتَأ** *al.* **مَهْنَتَأ** *نَهْرَنِيθُوس*, hyacinthus.

مَهْنَتَأ *id.*

مَهْنَتَأ *et* **مَهْنَتَأ** hyacinthus.

ලැංගුව; මේ ඝෝත්‍යාචාරින්ස්, de
more, secundum consuetudi-
nem.

γύπτιος, pers. **γύπτιον**, excubiae, vigiliæ.

مَعْ, *nng.* أَتَافُ, fut. act.
mutuatus est. Part. act.
أَتَافُ, مَعْفًا. Part. pass.
مَعْفًا, مَعْفُ, mutuo accep-
tus; subst. mutuum; ap.
gramm. adscititius.

Ethpe. εἴρι mutuo sumptus est.

Aph. ۹۰۱ mutuo dedit, fœneratus est.

Ettaph. ஏத்தப் pass.

¶ et ¶ mutuo accipiens,
fœnerator.

מְרַעַת, מְרַעַת, אֲרַעַת vel אֲרַעַת, st. c.
מְרַעַת, pl. אֲרַעַת mutuum; fœ-
nus.

فِي مَنْفَعٍ fœneratorum more.

مُعْتَدِلًا mutatio.

مَهْدِيٌّ fœnerator.

مَأْمُوا ut مَهَا قَنْتَاهَا .

جیو لایم commodatus.

مسدہ caligo, fumus densus ;
rogus ; pulvis, cfr. سدہ .

וְיַד, et unus fuit, unitus
fuit.

Ethpa. unitus est, se univit.

Aph. $\ddot{\text{w}}\ddot{o}\ddot{l}$, v. $\ddot{\text{w}}\ddot{l}$.

Schaph. **حَفَّ** separavit, solitarium reddidit. **نَفَّهُ** **حَفَّ** se segregavit. *Part. pass.* **حَفَّةً**, **حَفَّةً**, *f. emph.* **حَفَّةً**, separatus, derelictus, solitarius. **حَفَّةً** filius unicus; *c.* **حَمْ**, impar rei; - *subst.* eremita.

Eschtaph. ~~لَوْكَلِ~~ pass. et refl.

مُمْكِنٌ unicus, singularis, ar.

مُشَبِّهُ مَاء solitarie, seorsum;
singulariter. **مُشَبِّهُ مَاء** spontanea generatione pullu-
lans.

~~Lo~~ units.

مُسْتَبْدِلٌ unicus ; solitarius ;
singularis, specificus, proprius ; -subst. anachoreta, monachus ; f. emph. **مُسْتَبْدِلٌ**, pl. **مُسْتَبْدِلَاتٌ**, proprietas.

مُسْتَبِدَّةٌ unitas, solitudo; vita monastica ; singularitas, proprietas.

مُهَبَّةً et **مُهَبَّةً** solitudo.

solitarie.

الْمَهْبُطُ solitudo.

مُسْتَهْلِكٌ	fut. مُسْتَهْلِكٌ abortum fecit, abortivum edidit.	natu mulierum ; vernaculus.
Pa. مُسْتَهْلِكٌ ut seq.		Ethpe. مُسْتَهْلِكٌ genitus est, natus est.
Aph. مُسْتَهْلِكٌ abortum procura vit.		Pa. مُسْتَهْلِكٌ obstetricis officio functa est mulier.
مُسْتَهْلِكٌ abortus, foetus aborti vus; trop. imperfectus; it., vel مُسْتَهْلِكٌ, velum reticulatum ad obtegendum caput.		Aph. مُولَّا genuit, generavit ; produxit, producere fecit ; obstetricis officio functa est mulier.
مُسْتَهْلِكٌ abortire faciens ; me dicamentum abortum produc ens.		Ettaph. مُولَّا pass. ; trop. productus est.
مُسْتَهْلِكٌ inusit. ; cfr. heb. חַלְה et ar. تَعْلَمَ, debilis fuit.		مُجْنَبًا, مُجْنَبًا partus, generatio ; nativitas ; progenies, proles, filius. مُجْنَبًا nativitas, dies natalis. مُجْنَبًا وَمُجْنَبًا genimen vitis. مُجْنَبًا وَمُجْنَبًا in colæ civitatis. مُجْنَبًا وَمُسْتَهْلِكٌ cogitationes mentis.
Aph. مُسْتَهْلِكٌ debilitavit ; defecit viribus ; c. مُسْتَهْلِكٌ impar fuit, non potuit ; desperavit.		مُجْنَبًا, st. c. مُجْنَبًا, pl. مُجْنَبًا parturiens ; genitrix. مُجْنَبًا Deipara.
مُسْتَهْلِكٌ deficiencia virium, desperatio.		مُجْنَبًا generatio.
مُسْتَهْلِكٌ desperatio.		مُجْنَبًا, pl. مُجْنَبًا mulier foecunda ; genitrix ; obste trix.
مُسْتَهْلِكٌ bubalus, ar. يَخْوَرُ مُسْكَنَهُ .		مُجْنَبًا, f. مُجْنَبًا genitor, genitrix.
مُسْتَهْلِكٌ niger factus est, cfr. أَفْعَلٌ .		مُجْنَبًا, f. مُجْنَبًا, infans, pl. m. مُجْنَبًا, f. مُجْنَبًا .
مُسْتَهْلِكٌ vel مُسْتَهْلِكٌ lacerta ; coturnix.		مُجْنَبًا infantia.
مُسْتَهْلِكٌ مُلَامَهَا, struthio.		مُجْنَبًا generatio, procreatio ; genealogia.
مُسْتَهْلِكٌ , fut. مُسْتَهْلِكٌ peperit, genuit, heb. لَدَدٍ, ar. مَدَدٌ. Part. act. مُجْنَبًا, f. emph. مُجْنَبًا .		
Part. pass. مُسْتَهْلِكٌ et مُسْتَهْلِكٌ gene ratus, natus ; trop. innatus.		

أَمْكَبَامَه et مَكَبَامَه vi generationis; jure nativitatis.

مَكَبَامَه, pl. مَكَبَامَه nativitas; generatio passiva.

مَهْكِبَامَه, مَهْكِبَامَه parturitio, generatio; nativitas. مَهْكِبَامَه وَهُوكَسَ regeneratio.

مَهْجِبَامَه generans, genitor; id quod ad generationem pertinet; producens, efficiens, f. مَهْجِبَسَامَه generatrix. حَلَّامَه مَهْجِبَسَامَه causa efficiens; it. obstetrix. آوَنَامَه مَهْجِبَامَه semen generationis.

مَهْجِبَسَامَه id.

مَهْجِبَسَامَه generatio. سَمَلَامَه مَهْجِبَسَامَه facultas generandi.

مَهْجِبَامَه, pl. حَلَّامَه generatio; origo.

مَهْجِبَامَه natus.

مَهْجِبَامَه nativitas.

inus.; cfr. حَلَّامَه et ar. زَوَّلَ .

Pa. حَلَّامَه irriguit.

Aph. حَلَّامَه ululavit; clamavit.

Part. حَلَّامَه, مَهْجِبَامَه, f.

ejulans, plangens.

حَلَّامَه ululans; hyæna.

أَنْجَدَامَه et مَهْجِبَامَه, it.

pl. تَكَهَامَه gemitus, ululatus.

مَلَفَ pro inus. أَكَفَ, nnq. أَكَفَ c. l prosth., fut. مَأْكَفَ, inf. مَهَاكَفَ, raro didicet, c. acc. vel حَلَّامَه rei. Part. act. مَذَفَ, Part. pass. مَكَفَ, pro quo pler. مَكَفَ.

Pa. مَأْكَفَ, fut. مَأْكَفَ, et pler. تَكَفَ docuit, c. dupl. acc. vel acc. pers. et حَلَّامَه docuit manus meas prælium. أَكْفَمَ حَلَّامَه doce nos orare; it. demonstravit, cum حَلَّامَه pers. et acc. rei; significavit, c. حَلَّامَه rei. Part. act. مَأْكَفَ, pler. مَذَفَ, in st. c. f. مَدَفَه præceptor, doctor. مَكَتَه مَكَتَه puerorum institutor. Part. pass. مَكَفَ. f. emph. مَكَفَ, pl. m., مَلَقَتَه, مَلَقَتَه, st. c. f. مَلَقَتَه, edocitus, exercitatus. مَلَقَتَه وَأَكْهَاه a Deo edoicti; it. adj. cicur.

Ethpa. أَنْكَفَ pass.; didicit.

مَهْجَفَه disciplina, studium; scientia, doctrina, inde religio; institutio, educatio. مَهْجَفَه وَنَصَفَه Nestorii errores. دَنَه مَهْجَفَه discipu-

lus ; eamdem religionem profitens. حُدْهُ مَحْفُنَا schola. doctrinalis, scientificus. مَكْهُفَا discens, discipulus, tiro. مَأْهُفَا بِإِمْكَهُفَا edictio discipulorum.

مَكْهُفَةً inscite, tironum instar.

مَكْهُفَةً docilitas.

مَكْهُفَا ، مَكْهُفَةً doctus, instruc-

tus ; peritus.

مَكْهُفَةً scientia ; instructio.

مَكْهُفَةً لِّ imperitia.

مَكْهُفَةً docte, sapienter.

مَلْكُتُمَا ، مَلْكُفُنَا f. praeceptor, magister, doctor,

Doctor Ecclesiae. مَلْكُفُنَا

، مَلْكُفُنَا Eunuchorum prin-

ceps.

مَلْكُفُنَا more docentium.

مَلْكُفُنَا ، pl. مَلْكُفُنَا doctrina, institutio ; eruditio ; commentarius, homilia.

مَلْكُفُنَا doctrinalis.

مَهْمَلْكُفُنَا instructionis capax ; persuasibilis ; pl. مَهْمَلْكُفُنَا acquisitae scientiae.

مَهْمَلْكُنَا unicornis.

^و مَهْمَلْكُنَا et مَهْمَلْكُنَا , c. l prosth. مَهْمَلْكُنَا , 3^a pers. pl. مَهْمَلْكُنَا , مَهْمَلْكُنَا et 2^a pers. sing. مَهْمَلْكُنَا , 1^a pers. sing. مَهْمَلْكُنَا et مَهْمَلْكُنَا ,

fut. مَهْمَلْكُنَا , imper. مَهْمَلْكُنَا et مَهْمَلْكُنَا , inf. مَهْمَلْكُنَا , part. مَهْمَلْكُنَا juravit, sacramen-

to se obligavit, fidem pro-

misit.

Aph. مَهْمَلْكُنَا jurare fecit ; adju-
ravit ; exorcisavit. مَهْمَلْكُنَا حَرَقَتْ حَرَقَتْ jurejurando ob-
strinxit eos filio suo.

Ettaph. مَهْمَلْكُنَا pass.

مَهْمَلْكُنَا jurator ; juratorius.

مَهْمَلْكُنَا ، pl. مَهْمَلْكُنَا et مَهْمَلْكُنَا jusjurandum, adju-
ratio, deprecatio.

مَهْمَلْكُنَا juramentum ; adjura-
tio.

مَهْمَلْكُنَا qui adjurat, exorcista.

مَهْمَلْكُنَا exorcismus.

^و مَهْمَلْكُنَا , heb. מְהֻמָּדָה et ar. مَهْمَلْكُنَا , pl.

مَهْمَلْكُنَا mare, fluvius ; lebes. مَهْمَلْكُنَا ab Occidente.

مَهْمَلْكُنَا ad Occidentem. مَهْمَلْكُنَا et مَهْمَلْكُنَا mare Mediterraneum. مَهْمَلْكُنَا vel مَهْمَلْكُنَا قَبْرَمَنْسَا

mare Mortuum. مَهْمَلْكُنَا مَهْمَلْكُنَا et مَهْمَلْكُنَا مَهْمَلْكُنَا mare Rubrum.

مَهْمَلْكُنَا marinus, maritimus.

مَهْمَلْكُنَا id. ; subst. nauta.

مَهْمَلْكُنَا piscis stagni ; turtur, ar.
يَمَار .

مَهْمَلْكُنَا ، st. c. مَهْمَلْكُنَا , pl. مَهْمَلْكُنَا مَهْمَلْكُنَا piscina, lacus.

امْعَنْدًا , v. s. مَهْدَ .

دَخْرَى مَهْنَدًا , مَهْنَدْ dexter ; dextera manus ; *metaph.* pactum, fides data ; impositio manuum, *inde ordinatio.* اِمْهَنْدَةً وَمَهْنَدْةً or- dinatio sacerdotalis. مَهْنَدْتَهُ مَهْنَدْنَاهُ votum Deo præsta- vit. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ salutem pacto petiit. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ ad dexteram sedens, ad dexteram Christi stans, *inde electus, beatus.* مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ a dextris ejus. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ a dextris ; recte. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ ad dexteram pertinens ; *trop.* rectus, jus- tus, felix, *pl. f.* مَهْنَدْنَاهُ res felices. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ latus dextrum. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ et مَهْنَدْنَاهُ australis regio. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ meridiem inter et orientem. اَوْهَا وَمَهْنَدْنَاهُ Arabia Felix (*ar.* اليمان). مَهْنَدْنَاهُ australis. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ mulus. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ nurus, sponsa. مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ sponsus, gener. مَهْنَدْنَاهُ uter magnus et pilosus.

— Ethpa. مَهْنَدْنَاهُ cognomine distinctus fuit ; *cfr.* مَهْنَدْنَاهُ s. اَمْنَاهُ .

مَهْنَدْنَاهُ مَهْنَدْنَاهُ et مَهْنَدْنَاهُ pl. مَهْنَدْنَاهُ et مَهْنَدْنَاهُ juvenis ; *cfr.* νεανίσκος, et seq.

لَكْتَهُ nnq. مَهْنَدْنَاهُ , fut. تَأْنِي , suxit ; *cfr.* heb. לְקַחַת . Ethpe مَهْنَدْنَاهُ , et مَهْنَدْنَاهُ lactatus est.

لَكْتَهُ lactavit.

Aph. مَهْنَدْنَاهُ , et raro لَكْتَهُ , id. trop. largitus est. Part. act. مَهْنَدْنَاهُ , مَهْنَدْنَاهُ ; f. emph. et subst. مَهْنَدْنَاهُ nutrix.

مَهْنَدْنَاهُ et مَهْنَدْنَاهُ lactens, infans.

مَهْنَدْنَاهُ et مَهْنَدْنَاهُ lactatio.

مَهْنَدْنَاهُ et مَهْنَدْنَاهُ id. مَهْنَدْنَاهُ collectaneus, ad collac- tationem pertinens. اِسْتَهَا مَهْنَدْنَاهُ fraternitas quæ ex collectatione oritur.

مَهْنَدْنَاهُ lac præbens, f. emph. مَهْنَدْنَاهُ nutrix.

مَهْنَدْنَاهُ et مَهْنَدْنَاهُ lactatio.

مَهْنَدْنَاهُ et مَهْنَدْنَاهُ , ar. يَاسِين , jas- minum.

لَكْتَهُ inus. in Pe. ; *cfr.* لَكْتَهُ auxit.

Aph. مَهْنَدْنَاهُ addidit, auxit ; c. مَهْنَدْنَاهُ major fuit ; seq. al. verb. æquivalat adverb. : magis ; iterum, rursus, ex. مَهْنَدْنَاهُ لَعْنَهُنْتَهُ magis eum oderunt.

iterum audi-
vi; اَنْ اَهْمَكْ لَعْنَهُ اَنْ اَهْمَكْ
non amplius quæsivit eam.

Ettaph. اَهْمَلَ لِ additus est;
auctus est, crevit.

augens. مَهْمَقْنَا

additio. مَهْمَقْنَهُ اَ

additi-
cius; f. pl. اَهْمَقْتَهُ اَهْمَقْتَهُ
additamenta; gramm. اَهْمَلَ اَهْمَلَ
litteræ additio-
ciæ, seu non radicales.

et اَهْمَلَ اَهْمَلَ et اَهْمَلَ, pl.
additio; incremen-
tum. اَهْمَلَ اَهْمَلَ كَوْنَهُ اَهْمَلَ, nec plus
nec minus.

additamentum, quod
redundat. مَهْمَقْ

et مَهْمَقْ, fut. تَأْخِدَة, tal-
mud. رَيْزَة, germinavit, pullu-
lavit; trop. exortus est.
Part. præs. مَهْمَقْ.

Aph. اَهْمَكْ germinare fecit,
protulit. مَهْمَقْ مَهْمَقْ barbam
coluit. اَهْمَكْ اَهْمَكْ herbam pro-
tulit.

germen, herba;
pinna muri, propugnaculum.

germinare faciens.

germinatio.

germen; propago; trop. effec-
tus, fructus. مَهْمَقْ وَسْطَهُ اَهْمَقْ

effectus suorum peccatorum;
c. وَمَعَ vertex capitis.

avis perdici similis, id. q.
ar. قَطْلَهُ.

، ar. وَغْلَهُ، caper monta-
nus (gall. chamois).

rheum planta; cfr. حَسْرَهُ.

— Inus. cfr. ar. وَعْدَهُ et heb.
רַיְזָה constuit, it. كَابُوا et حَلَّا.

، مَهْمَقْ avidus, gulosus.
كَهْمَهْتَهُ اَهْمَهْتَهُ rapaces latrones.

Pa. مَهْمَقْ denomin., avidum reddi-
dit, ad gulam incitavit.

Ethpa. اَهْمَكْ avidus fuit;
cupidine exarsit.

avide. مَهْمَقْ

cibi appetitus,
aviditas, gula; cupiditas.

، heb. رَيْزَهُ spinetum, vep-
res; surculus vitis.

formा inus. verbi بَلْ ; al.
sensu cfr. ar. وَقَى satisfecit.

Aph. اَهْمَكْ sufficit rei, potuit;
rem confecit, perfecit; defe-
cit, cessavit, evanuit; con-
sumpsit, exhausit. Part. act.
، مَهْمَقْ perficiens; ces-
sans.

deficiens. مَهْمَقْ ، مَهْمَقْ

مَهْفَعْتَمَا consumptio; cessatio, defectus.

مَهْفَعْتَمَا cessans.

مَهْفَعْتَمَا pistor; cfr. آفَمَا.

مَهْفَعْتَمَا præputium.

مَهْفَعْتَمَا, إِنْسُورِس, equisetum planta (gall. prêle).

مَهْفَعْتَمَا crassus.

مَهْفَعْتَمَا junctura cubiti, cubitus; cfr. heb. אַצְל ar. وَضْن.

مَهْفَعْتَمَا, nnq. أَمْرُك, fut. تَأْرُك sollicitus fuit; curavit, curam adhibuit, sœpe c. ۲, ۳, vel ۴ rei; بِعَمَقَمْ لَأْرُوك nolite solliciti esse animæ vestræ; seq. al. verbo

equivalat adverb. diligenter; مَهْفَعْتَمَا diligenter scripsit.

مَهْفَعْتَمَا بُهْدَمْ quæ sua sunt cura-

vit. مَهْفَعْتَمَا كَهْمَتْ de crastino sollicitus fuit. Part. act. مَهْفَعْتَمَا,

مَهْفَعْتَمَا بُهْدَمْ بُهْدَمْ كَهْمَتْ; مَهْفَعْتَمَا

sollicitus est homo circa res quibus indiget. Part. pass.

مَهْفَعْتَمَا, is, id de quo cura-

tur; exquisitus; necessarius.

مَهْفَعْتَمَا هَهْدَمْ مَهْفَعْتَمَا res magni mo-

menti.

Ethpe. أَمْرُك curæ fuit; re- quisitus est; c. ۲, curam gessit, providit, sollicitus fuit de re.

Pa. مَهْفَعْتَمَا id. q. Pe.

Ethpa. أَمْرُك لَأْلَمْ id. q. Ethpe.

مَهْفَعْتَمَا, st. c. مَهْفَعْتَمَا, c. aff. مَهْفَعْتَمَا etc., pl. مَهْفَعْتَمَا sollicitudo, cura, providentia; diligentia; cfr. c. al. sensu فَرْجَمْ .

مَهْفَعْتَمَا curans; curator, pro- videns.

مَهْفَعْتَمَا diligenter.

مَهْفَعْتَمَا et مَهْفَعْتَمَا diligens; curator.

مَهْفَعْتَمَا ut مَهْفَعْتَمَا.

مَهْفَعْتَمَا ruber purus.

مَهْفَعْتَمَا مَهْفَعْتَمَا studiosus.

مَهْفَعْتَمَا مَهْفَعْتَمَا studiose.

مَهْفَعْتَمَا, pl. مَهْفَعْتَمَا, ut مَهْفَعْتَمَا مَهْفَعْتَمَا accuratus.

مَهْفَعْتَمَا, مَهْفَعْتَمَا et مَهْفَعْتَمَا مَهْفَعْتَمَا populus, gens, tribus.

Ethpalp. أَمْرُك لَأْلَمْ v. denom., po- pulus factus est.

مَهْفَعْتَمَا inus.; cfr. heb. רַצֵּר formavit.

Aph. مَهْفَعْتَمَا et nom. لَأْلَمْ , v. s.

أَلْفَمْ .

مَهْفَعْتَمَا, heb. رَصَدْ , مَهْفَعْتَمَا voluntas, indoles; propensio, cupiditas, affectus, libido; odium.

Ethpa. مَهْفَعْتَمَا v. denom., cupiditate illectus est, victus est.

مَهْفَعْتَمَا vel مَهْفَعْتَمَا cupiditatibus deditus, pravus.

مَوْتَمَا obsequium cupiditatis
bus.

مُكْ εἰλκῆ, frustra, incassum.
مَكْلَلٌ et مَكْلَلٌ, pl. مَكْلَلٌ; ἀγκύλη
ansula chlamydis.

مَهْلَلٌ id.

مَهْلَلٌ et مَهْلَلٌ, fut. نَامَ, heb. יָרַק,

ar. وَقَدْ , combustus est, incensus est ; arsit, exarsit.

Part. مَهْلَلٌ ; f. emph. مَهْلَلٌ , subst. fomes.

Ethpe. مَهْلَلٌ id. q. Pe.

Pa. مَهْلَلٌ combussit.

Ethpa. مَهْلَلٌ incensus est.

Aph. مَهْلَلٌ combussit ; trop. inflammavit. مَهْلَلٌ نَهْلَلٌ eum igne cremavit.

Ettaph. مَهْلَلٌ pass.

مَهْلَلٌ exustio, incendium ; it. sed pler. seq. مَهْلَلٌ holocaustum.

مَهْلَلٌ, مَهْلَلٌ incendium, inflammatio ; calor, æstus febris, ventus ; fomes.

مَهْلَلٌ ardens, fervidus.

مَهْلَلٌ incendium.

مَهْلَلٌ, f. emph. مَهْلَلٌ ardens ; combustus.

مَهْلَلٌ foculus, ar. مَوْقَدَةٌ .

مَهْلَلٌ, f. مَهْلَلٌ vim habens urendi ; ardens.

مَهْلَلٌ urendi capax.

مَهْلَلٌ vis comburendi.

مَهْلَلٌ exustio.

مَهْلَلٌ et مَهْلَلٌ ύγκυνθος , hyacinthus ; cfr. مَهْلَلٌ .

مَهْلَلٌ c., pl. مَهْلَلٌ εἰλκών, similitudo, species; forma, effigies ; imago, pictura, numisma ; symbolum ; exemplar libri ; ap. gramm. forma nominis, vel verbi.

Pa. مَهْلَلٌ verb. denom., repræsentavit, figuravit ; descriptis, designavit. مَهْلَلٌ nummos principis imagine procudit.

Ethpa. مَهْلَلٌ pass.

مَهْلَلٌ et مَهْلَلٌ figurativus ; characteristicus, f. مَهْلَلٌ .

مَهْلَلٌ effigie expressus.

مَهْلَلٌ repræsentatio.

مَهْلَلٌ et مَهْلَلٌ, fut. نَامَ, ar. وَقَرْ , gravis fuit, gravis factus est, molestus fuit, spec. c. مَهْلَلٌ pers. ; gravatus est ; trop. carus, rarus ; pretiosus, glorirosus fuit. مَهْلَلٌ حَتَّىَمَهْلَلٌ oculi ejus graviores sunt quam ut videant. **Part.** مَهْلَلٌ حَكَمَهْلَلٌ ; مَهْلَلٌ , مَهْلَلٌ præs. مَهْلَلٌ ; مَهْلَلٌ vobis molestus est.

Ethpe. مَهْلَلٌ gravatus est.

Pa. مَهْلَلٌ honoravit, veneratus

est ; honori dedit, c. acc. *rei* et *pers.*; حَمَّلَ أَنْهَى si non essem cui observantissimus. Part. act. et pass. مَحْمَدٌ, f. emph. مَحْمَدٌ; honorabilis, venerabilis ; pretiosus. دَافِعٌ مَحْمَدٌ lapides pretiosi.

Ethpa. مَحْمَدٌ pass.; pretiosus fuit.

Aph. مَكَّا aggravavit, onus imposuit; c. *pers.* molestus fuit ; honoravit, honorabilem fecit. لَئِنْ مَحْمَدٌ honor quem assecutus sum.

Ettaph. مَكَّا gravatus est. مَحْمَدٌ pondus. مَحْمَدٌ pondus, onus ; cura ; trop. molestia.

مَعْمَدٌ penuria ; annonae caritas.

مَحْمَدٌ, et مَفْرُودٌ, pl. مَحْمَدٌ honor, gloria ; dignitas, premium ; donum, munus ; impensae ; margo libri. حَامِنٌ وَنَدِيٌ suis sumptibus. مَحْمَدٌ وَنَدِيٌ monumentum funebre.

مَحْمَدٌ et مَحْمَدٌ, pl. مَحْمَدٌ onus, impedimenta ; suppellex, sarcina ; familia.

مَحْمَدٌ et مَحْمَدٌ gravis, latus ; maturus, sapiens.

مَحْمَدٌ مَحْمَدٌ gravis ; trop. difficilis, molestus ; carus, pretiosus ;

honestus ; c. مَكَّا p. dilectus ; مَهْمَتٌ لَئِنْ مَحْمَدٌ magno pretio margarita ; pl. f. مَهْمَتٌ, subst. res dignæ. مَهْمَتٌ وَجَدَ Sacraenta Ecclesiæ ; adv. مَهْمَدٌ care, magnis expensis. مَهْمَدٌ graviter, difficile ; cum honore ; care.

مَهْمَدٌ gravitas, dignitas, reverentia, *titulus honoris*.

مَهْمَدٌ Reverentia Vestra ; it. pondus ; suppellex.

مَهْمَدٌ vitellus *ovi*.

مَهْمَدٌ honorifice.

مَهْمَدٌ dignitas.

مَهْمَدٌ honorator.

مَهْمَدٌ reverentia.

مَهْمَدٌ مَهْمَدٌ aggravans, molestans.

مَهْمَدٌ مَهْمَدٌ aggravatio.

مَهْمَدٌ, ar. قُرْبَانٌ, bufo, rana.

مَهْمَدٌ inus.; cfr. heb. מִזְבֵּחַ, et Hiph. הָרַחֲמָה docuit ; inde seq.

مَهْمَدٌ targ. אֹורְדִּיןָא, lex divina spec. lex mosaica ; per extens. Scriptura tota , ar. تُورَةَ.

مَهْمَدٌ vel مَهْمَدٌ fut. magnus factus est ; crevit, exaltatus est, se extulit ; c. مَهْمَدٌ major fuit, præstantior fuit.

مَهْمَدٌ مَهْمَدٌ elata sunt eorum corda. مَهْمَدٌ مَهْمَدٌ crevit nomen ejus præ patre.

<i>Part. pass.</i> مُنْتَهٌ . Part. pass. أَنْتَهٌ vel أَنْتَهٌ .	רָוֵם אַנְתֵּה inus. ; cfr. אַנְתֵּה et heb. altus fuit.
<i>Aph.</i> מָגָנוֹן magnum fecit, exaltavit; auxit, amplificavit, dignitate auxit. <i>Part. act.</i> مَهْوَدًا ; in <i>pl.</i> مَهْوَدَاتٍ ; مَهْوَدٌ cantus Magnificat.	רָוֵם אַנְתֵּה extulit.
مَهْوَدٌ exaltator, laudativus.	מְמֻנָּה , pl. מְמֻנָּה , heb. וִרִינָה , velum, cortina ; tapes, aulæum, tentorium, tabernaculum ; per ext. familia.
مَهْوَدَاتٍ magnificatio.	מְמֻנָּה , ar. مَرَاعَة , cicendula (gall. ver-luisant); cfr. מְמֻנָּה .
مَهْوَدَاتٍ mus jerboa seu sylvesteris, ar. جَبَّوْعَةٌ .	↑ ↗
مَهْوَدٌ cacumen arboris.	مَهْوَدٌ , fut. تَأْوِفٌ pallidus fuit ; cfr. مَرِيقٌ regio morbo laboravit.
مَهْوَدَاتٍ vel مَهْوَدًا تَأْوِفٌ cacumen montis ; torrens.	Pa. مَهْوَدٌ pallescere fecit. <i>Part. pass.</i> مَهْوَدًا pallidus.
مَهْوָוָה , pl. مَهْوָוָה puteus, lacus, piscina ; cfr. heb. יְדָה defluit et ar. وَزْدٌ fons aquæ.	Ethpa. مَهْوَدًا ? pallidus factus est.
مَهْوָוָה vel أَمْهَسٌ , emph. مَهْسٌ , pl. مَهْسٌ , مَهْسَسٌ mensis. مَهْسٌ مَهْسَسٌ mensis integer. وَهُمْ مَهْسٌ neomenia.	Aph. מָגָנוֹן id. q. Pa. et Ethpa.; it. viruit.
مَهْسَسٌ circulus mensis.	مَهْسָنָה , ar. رَجْقَانٌ , pallor ; rubigo ; morbus regius (gall. la jaunisse) ; uredo.
مَهْسَنٌ menstruus, quovis mense occurens.	مَهْسָנָה , pl. مَهْسָנָה olus ; cfr. ar. وَرَقٌ virentia folia.
مَهْسَنٌ quolibet mense.	مَهْسָנָה , pl. مَهْسָנָה dim. oluscum, olus viride.
مَهْسָנָה , fut. تَأْوِفٌ longus fuit. cfr. مَهْسָנָה et heb. תְּאֵן id.	مَهْسָנָה مَهْسָנָה flavus, pallidus ; subst. olus.
مَهْسָנָה vel مَهْسָנָה , tatar. يَارِيلِيقٌ , mandatum regium.	مَهْسָנָה مَهْسָנָה pallor ; herba virens.
مَهْسָנָה , ar. وَرَلٌ , grandius lacertæ genus, crocodili species.	مَهْسָנָה مَهْسָנָה pallor.
	مَهْسָנָה , pl. مَهْسָנָה canis aureus (gall. chacal) ; سَكَنْدَه مَهْسָנָה

*opopanax seu succus panacis
plantæ.*

רֶשֶׁת, *nng.* **לִמְצָא**, *fut.* **לִמְצָא** *heb.*
רֶשֶׁת, *ar.* وَرَثَ, *haeres factus est;* *hæreditate accepit, cepit, occupavit.* *Part. act.* **لِمْتָה**, **لِمْتָה**; *subst., pl.* **لِمْتָה** *hæres, possessor.*

*Ethpe. L̄.L̄ vel L̄.L̄ hæres
factus est.*

Aph. 150̄ hæreditati dedit,
hæredem constituit; posside-
re fecit. *c. dupl. acc.* 150̄

falsi
dii quos hereditati tradide-
runt nobis patres nostri.

لُوْلَجْهَهُ et لُولَجْهَهُ hæreditas,
possessio.

Lo ^८, **lō** ^९, *pl.* **lō** ^८ **haeres**,
possessor, *f.* **llo** ^{१०}, *pl.*
llō ^{११}.

إِلْهَى, pl. **إِلْهَاتٍ** hæreditas; possessio. **حَتَّى** cohæredes.

مَلِكُوه hæredem faciens.

f^{a} vel f^{a} tinea; vermis.

مَعَ - *Aph.* مَهْتُ movit,
extendit, *pler. c.* مَهْتُ et مَهْتُ
vel مَهْتُ rei; injuriam tulit,
c. مَهْتُ.

مَعْلُوٌ - *Aph.* مَعْلُوٌ extendit,
admovit; porrexit, *pler.* seq.
أَبْرَأَ; *trop.* auxilium præ-
buit, *sæpe cum* أَنْسَابِ pers.; c.
أَرْتَأَ irruit in. أَبْرَأَ مَعْلُوٌ
أَخْرَقَ porrexit manum suam
cum aliquo: conspiravit.
أَرْتَأَ مَعْلُوٌ sagittas immisit.
أَرْتَأَ مَعْلُوٌ mortem ei in-
tulit. مَعْلُوٌ كَوْهِ وَنَسْتَانِ ei
auxilium porrexit. كَلْمَانِ مَعْلُوٌ
أَنْسَابِ capitи coronam impo-
suerunt.

Ettaph. **கூல்லி** pass. ; pro-
fecit.

Schap.  crescere fecit,
promovit, extendit.

Eschtaph.  pass. et refl.; profecit.

تَدْرِيْسٌ et **تَدْرِيْسٌ** progressio;
profectus: aetatis incrementa.

Laffer progressus, proces-

لِفْرَمَدْهُ, f. **لِفْرَمَدْهُ** pro-
grediens; nomen metri dode-
casyllabi in poesi.

لِيُنْهَا مَعْدُونٌ promotio; progressus.

Hæ guttur vel œsophagus.

سَقَرَ, *inus.*; *cfr. heb.* שָׁנָה *et ar.* سَقَرَ *dormivit.*

حَنْدَا, st. c. حَنْدَى, ex prim.
مَعْنَدَا, somnus. حَنْدَى مَعْنَدَا somno-
lentus.

مَعْنَفِ inus.; cfr. مَعْنَفِ s. فَعْ .
Aph. مَهْلَقِ adjuvit.
مَعْنَفِ vel مَعْنَفِ auxilium, juva-
men.
مَعْنَفِ et مَعْنَفِ, λασπίς, jaspis.;
cfr. ar. يَثْرَ et pers. يَثْرَ .

مَدَا c., essentia, natura,
substantia, existentia; τὸ
esse; ipse, ipsa; c. affixis
nota est pronom. reflex. et
tunc idem valet ac تَعْفِ ;
مَدَّا لَمْ لَوْحَمَدَّا si non noveris
teipsam; حَمَّامَهَ حَمَّامَهَ te ipsum corrumperet; nnq.
ponitur pro pronom. person.
ex.: قَاتَكُورَ حَلَّا مَدَّا حَلَّهُ
acuerunt ferrum suum con-
tra illum; adverb. c. variis
præpos. مَدَّا, et nnq. مَدَّا
per se, inde revera; مَدَّا
id.; مَدَّا لَّا de scipso, ad seip-
sum. حَمَّامَهَ حَمَّامَهَ حَمَّامَهَ vel لَهُمَّا حَمَّامَهَ حَمَّامَهَ
liberum arbitrium. مَدَّا لَّا مَدَّا
nihilum, non existentia; tan-
dem مَدَّا in vers. V. T. æqui-
valet hebr. מַא, imprimis notat accus.
حَمَّامَهَ حَمَّامَهَ Deus creavit cœlum.

مَدَّانَةً, f. مَدَّانَةً, pl. f. مَدَّانَةً
essentialis.

مَدَّانَةً essentialiter, per se.

Pa. لَهُ verb. denom. essentiam,
existentiam dedit.

مَدَّانَةً مَدَّانَةً existentiae dator.

مَادَّ, nnq. مَادَّ, heb.
רִשְׁבָּה et hymiar. رَكْبَةٌ, fut.
مَادَّ, imp. أَدَّ, inf. مَادَّah
vel مَادَّah sedit, consedit;
insedit equo etc., c. مَدَّا vel مَادَّah;
obsedit, c. مَادَّah; permansit,
versatus est; trop. judicavit,
regnavit; intrans. habitatus
est, situs est.
مَادَّ مَنْ مَعْنَيَا مَادَّah sedit ad Dei dexteram.
مَادَّah مَادَّah primum
locum obtinuit. مَادَّah مَادَّah
mare ingressus est. مَادَّah مَادَّah
urbem circumdede-
runt. Part. præs. مَادَّ, emph.
مَادَّah, subst. habitator; f.
emph. مَادَّah terra habitata,
orbis terræ. مَادَّah مَادَّah
قَلَّمَهُونَ exonerans ven-
trem. مَادَّah مَادَّah habitantes
in domibus; مَادَّah مَادَّah ha-
bitatores deserti; مَادَّah مَادَّah
urbes habitatae. لَمْ مَادَّah مَادَّah
نُونَ مَادَّah nunquam habitabitur
civitas.
Pa. مَادَّah habitatoribus imple-

vit urbem, restauravit ; firmavit. Part. pass. مُكَّدْتَ habitatus, etc.; *adj.* firmus, gravis.

Ethpa. مُكَّدْلِي pass.

Aph. مُكَّدْلِي vel raro. مُكَّدْلِي, sedere fecit, manere fecit, constituit, habitare fecit *urbem*; mulierem secum cohabitare fecit *seu* in matrimonium duxit. مُكَّدْلِي أَفْسَمْفَرْأَوْ لَوْنَجْمَعْ constituerunt eum episcopum.

Ettaph. مُكَّدْلِي incola factus est; habitavit.

مُكَّدْنَسْ sedes, habitatio; habitatores.

مُكَّدْنَسْ, contr. مُكَّدْلِي, it. مُكَّدْنَسْ vel مُكَّدْنَسْ excrementum.

مُكَّدْنَسْ مَوْلَهْ latrina.

مُكَّدْنَسْ مَحْكَمَتْ sedens.

مُكَّدْنَسْ مَحْكَمَتْ sedes, mansio, diversarium.

مُكَّدْنَسْ مَحْكَمَاتْ pl. مَحْكَمَاتْ sedes, habitatio, domicilium; sessio, consessus, cathedra; thronus; *in plur.* etiam Throni Angelorum ordo; sectiones Psalmorum quæ nostris Nocturnis respondent. مُكَّدْنَسْ مَحْكَمَاتْ hujusmodi Psalmi in Nocturnos divisi; *it.* liber Judicium. مُكَّدْنَسْ مَحْكَمَاتْ assessor. مَحْكَمَاتْ præses.

مُكَّدْنَسْ quies.

مُكَّدْلَى, f. مُكَّدْلَى, pl. m. مُكَّدْلَى peregrinus, advena, inquinus.

مُكَّدْلَى peregrinatio; incolatus.

مُكَّدْنَسْ, مُكَّدْنَسْ f. مُكَّدْنَسْ orphanus; orbatus; cfr. يَتِيمٌ et id.

Pa. مُكَّدْنَسْ v. denom., orbavit, orphanum reddidit.

Ethpa. مُكَّدْلِي pass.

مُكَّدْنَسْ status orphani, orbitas.

مُكَّدْنَسْ f., euphorbia *planta, ar.* يَثْرَوْ.

مُكَّدْنَسْ vel مُكَّدْنَسْ folium, charta; codex.

مُكَّدْنَسْ vel مُكَّدْنَسْ fut. مَلَأْ, imper. مُكَّدْنَسْ superfluit, reliquus fuit; redundavit, abundans fuit; lucratus est, profecit. Part. act. مُكَّدْنَسْ, مَلَأْ.

Pa. مُكَّدْنَسْ abundare fecit, majorem fecit. Part. pass. مُكَّدْنَسْ, مُكَّدْنَسْ f. emph. مُكَّدْنَسْ pl. f. emph. مُكَّدْنَسْ magnus, major; *adj.* optimus, maximus, excellens *titulus dignitatis*: مُكَّدْنَسْ مَنْزَلْ أَفْسَمْفَرْأَوْ venerabilis Sergius episcopus; *in pl.* f. res præclaræ, vir-

tutes. حَلَّ وَمَنْهُقُ، حَلَّكَةٌ de præstantibus rebus tota cura ejus erat ; it. مَنْكَةٌ part. denom a حَلَّكَةٌ, chorda instructus arcus.

Aph. حَلَّكَلٌ auctus est, crevit, abundavit, profecit, excelluit, melior factus est, c. حَلَّ rei.

Aph. حَلَّوْلٌ superabundare fecit residuum reliquit ; profuit, profecit, utilitatem percepit c. حَلَّ vel حَلَّكَلٌ . حَلَّوْلٌ reliquum tempus hiemis transegit. حَلَّوْلَهُ وَحْدَهُ quod superest. Part. حَلَّكَةٌ، حَلَّكَلٌ؛ حَلَّكَلٌ حَلَّكَلٌ حَلَّكَلٌ verba ejus omnibus prosunt.

حَلَّكَلٌ، حَلَّكَلٌ، usus, utilitas, lucrum ; abundantia ; id quod superest.

حَلَّكَلٌ، حَلَّكَلٌ، f. emph. حَلَّكَلٌ، pl. حَلَّكَلٌ، multus, magnus ; major, melior, præstantior ; nimius, supervacaneus ; impar, longe stans a, remotus ; subst. in pl. f. emph. prodigia ; حَلَّكَلٌ cognomen ; adverb. حَلَّكَلٌ valde, magis, admodum, supra modum, nimis.

مَنْهُقُ حَلَّقُ أَسْتَدْكَرْبَهُ me dilexisti magis quam te ipsum.

حَلَّكَلٌ vel حَلَّكَلٌ quam maxime ; حَلَّكَلٌ vel حَلَّكَلٌ magis quam.

حَلَّكَلٌ حَلَّكَلٌ حَلَّكَلٌ multo magis. حَلَّكَلٌ plus minus.

حَلَّكَلٌ حَلَّكَلٌ vel حَلَّكَلٌ circiter. حَلَّكَلٌ maxime, præsertim.

حَلَّكَلٌ حَلَّكَلٌ، pl. حَلَّكَلٌ excellentia ; abundantia, superfluitas ; humores, excrementa ; adv. حَلَّكَلٌ nimis. حَلَّكَلٌ supervacanea.

حَلَّكَلٌ، حَلَّكَلٌ، ar. حَلَّكَلٌ، chorda, nervus ; trabs.

حَلَّكَلٌ، f. حَلَّكَلٌ utilis, commodus, ditans.

حَلَّكَلٌ، pl. حَلَّكَلٌ utilitas, emolumentum.

حَلَّكَلٌ excellenter, maxime.

حَلَّكَلٌ excellentia, præstantia ; virtus ; vita ascetica.

حَلَّكَلٌ حَلَّكَلٌ nimia longitudo ; excellentia.

حَلَّكَلٌ، حَلَّكَلٌ، pl. حَلَّكَلٌ quod superest, reliquiae ; superabundantia ; trop. thesauri, horrea.

ح, cui nomen ده, undecima littera Syrorum; est una ex sex litteris: لـهـنـوـنـ، quae pro positione duplarem sonum habent, mollem scilicet vel durum: حـ durum sonat ut ρ Arabum seu K, et tunc puncto superno insignitur; حـ molle sonat ut ς Arabum, (ch) Germanorum, et inferno puncto notatur. Valet numerice: حـ = 20, حـ = 200, etc. Äquivalet tum hebr. حـ, tum ar. حـ et سـ, rarius heb. حـ, ut حـ بـرـيـةـ, حـكـمـةـ, خـلـقـةـ; reddit plerumque græcum γχ: حـكـمـةـ ζχλ~ος, turba; حـمـمـةـ εχ~εν~ος, peregrinus.

هـ, heb. حـ, hic, illuc, non existat nisi cum aliis partic. compositum; cfr. حـمـمـاـ ubi, حـمـمـاـ unde, حـمـمـاـ hic, exinde, حـمـمـاـ illuc, حـمـمـاـ hue et حـمـمـاـ inde etc., vide singula in suo loco alphabetico.

حـلـاـ, hebr. حـلـاـ, pro حـلـاـ, scil. c. l quiescente pro hamza Arabum; 3^a pers. f. حـلـاـ, pl. حـلـاـ; 1^a pers. sing. حـلـاـ, pl. حـلـاـ; fut. حـلـاـ, imper. حـلـاـ, f. حـلـاـ; infin. حـلـاـ, increpavit, pler. c. حـلـاـ pers.-Part. act. حـلـاـ تـعـمـلـاـ. حـلـاـ فـلـاـ حـلـاـ فـلـاـ molle vituperium quo arguit.

Ethpe. حـلـاـ pass.

Pa. حـلـاـ fortiter increpavit.

Ethpa. حـلـاـ pass.

حـلـاـ et c. excidio aleph حـلـاـ, pl. حـلـاـ, increpatio, reprehensio; c. al. sensu v. s. لـهـ. حـلـاـ et حـلـاـ id.

Pa. حـلـاـ, verb. denom., increpavit; correxit, emendavit.

Ethpa. حـلـاـ pass.

حـلـاـ redargutor, correctivus.

حـلـاـ correctio.

أـهـ, v. s. حـلـاـ.

حـلـاـ, heb. حـلـاـ, ar. حـلـاـ, fut. حـلـاـ, doluit, pler. c. حـلـاـ pers. et حـلـاـ rei. Part.

præs. فَأَدَّ , فَأَدَّ ; *imperson.* فَأَدَّ كَ حَلَّ , حَلَّ dolui, doluimus de; *adj.* tristis, dolorosus; *cfr.* حَدَّ s. .

Ethpe. إِلَيْهِ اَنْدَادٌ pro إِلَيْهِ اَنْدَادٌ , nnq. debilitatus est, languit.

Ethpa. إِلَيْهِ اَنْدَادٌ *id.* ; doluit.

Aph. اَنْدَادٌ et اَنْدَادٌ dolere fecit, afflixit. *Part. act.* مَخَافٍ , f. مَخَافٍ , pl. مَخَافٍ , emph. مَخَافٍ affligens; nnq. dolens, æger. *Part. pass.* مَخَافٍ , مَخَافٍ , nnq. مَخَافٍ , pl. مَخَافٍ afflictus, æger.

حَكَبَةٌ nnq. ar. حَكَبَةٌ , حَكَبَةٌ , pl. حَكَبَاتٌ , st. c. dolor, morbus; passio. حَكَبَ حَمَّةٌ dysenteria. حَكَبَ فَلَنْيَا variolæ. حَكَبَ حَمَّةٌ بَعْقَلَةٌ hemiplegia, paralysis. حَكَبَ حَمَّةٌ وَمَعَا hemiceranium(gal. migraine). حَكَبَ وَمَعَا cephalalgia. حَكَبَ حَمَّةٌ morbus junc- turarum seu articularis.

فَسْخَا , فَسْخَا , nnq. فَسْخَا , dolens, dolore affectus.

حَافُّا dolorificus.

دَاهِدَةٌ dolens; ægrotus.

دَهْمَةٌ afflictio.

تَهْنَرٌ dolens.

مَحَادَهٌ affectio morbida.

مَحَاجَنَةٌ affligens, f. مَحَاجَنَةٌ .

مَحَاجَنَةٌ dolor.

فَهْمَلَلٌ , v. حَلَّهُمَلٌ .

دَافٌ et دَفٌ , assyr. kaiwanu et ar. كَيْوَانٌ , Saturnus; trop. plumbum.

فَاحِحَّا يُخَالِبَرْنη , galbanum. فَعَمَهُنٌ sub فَعَمَهُنٌ v. فَعَمَهُنٌ .

حَلَّصَةٌ , cfr. ar. حَمَّا et heb. כְּבָרִי , scilicet, id est, verbi gratia; quasi, ergo; seq. ? scilicet qui, scilicet ut (ar. كَيْمَا).

حَلَّ , ar. خَانٌ , vox tatar. , Khanus, rex.

فَهْ . دَانٌ et deriv., v. s. دَانٌ , دَانٌ , فَاقْتَسَى f. , pl. فَاقْتَسَى , الرُّوكَسْ ,rupes, lapis; magnes; gemma; trop. idola; *adject.* بَحَافُ دَاهِدٌ وَهَكَارٌ chrysolithus gemma. دَاهِدٌ وَسَهْدَهْ calx viva. دَاهِدٌ وَهَبَّتَهْ lapis adorationis: bethyle, idolum lapideum. فَاقْتَاسَى وَهَفَّتَهْ sapphirus. دَاهِدٌ وَهَفَّتَهْ lapis distinctionis: perpendiculum muratorum. دَاهِدٌ وَسَهْدَهْ , ar. حَجَرُ الرَّحَى , heb. لَبِرَهِيمَهْ , lapis molaris; mola. فَاقْتَاسَى وَسَهْدَهْ gemmæ. دَاهِدٌ وَهَعَمَهْ adamas; in pl. calculus vesicarius.

دَاهِدَهْهَهْ dim. , lapillus. *Ethpa.* فَاقْتَفَ إِلَيْهِ verb. denom., lapis factus est.

دَافِئْتَا, *nng.* et **دَافِنْتَا**, *lapideus.*

دَافِنْتُ مَفْنِيْمَا saxitas, natura lapidea.
دَافِنْتُ دَافِنْتُ ut.

حَلَّةٌ - *Part. act.*; **فَلَّةٌ**, vitu-
perans.

Pa. حَانَةٌ, حَاهَةٌ, حَاهَةٌ, *nnq.*, *fut.* حَاهَةٌ, *fut.* حَاهَةٌ, *reprehendit*,
pudefecit. *Part. act. et pass.* حَاهَةٌ; *adj.* حَاهَةٌ; *pro* حَاهَةٌ *reprehensione dignus*;
turpis, deformis. حَاهَةٌ *subducto vultu.*

Ethpa. ةَدْلِيٌّ et ةَفَلِيٌّ pass.

Aph. اخّا؛ pudore affecit.

فَهُوَا et فَهُوَا reprehen-
sio; pudor, ignominia.

لَامِنْ , لَامِنْ , languidus.

مَدْلُوْتاً reprehensio;

tas; asperitas vultus.

مَدْعُونٌ *austerum faciens.*

גָּאֹדֶה, gaudium.

vel حَلْوَاً seria, urceolus;
acetabulum; *cfr.* حَلْوَة s. ٦.

حَافِظْتُ *yápis*, gratia, favor.

خاتون, *turc.* regina, ma-

trona.

Digitized by Google

دُحَل *inus.*; *cfr.* **كَبَّ** *collegit,*
verrit purgamenta.

لَمْ يَفِي simus.

حَمْرًا *sæpius in pl.* **لَّهْمًا** *id.*; *acervus.*

مَحْكَمٌ aromatica planta piperi
similis, ar. **كَبَّانَةٌ**.

فَحْصاً , ar. كَبَّة , glomus fili.
فَهْمَا , فَهْمَا spina, rubus;
gossypion; cfr. ar. كَبَّة planta salsa et combustioni apta;
it. vas, poculum, gr. κυπάρι, ar.
فَهْمَا فَهْمَا vel فَهْمَا سَفْوَا . كُرْبَبَهْمَا فَهْمَا سَفْوَا . كُرْبَبَهْمَا فَهْمَا دَنْهَمَا et فَهْمَا فَهْمَا سَنْهَمَا et فَهْمَا سَنْهَمَا rubus fruti-
ticosus (ar. غَلَقْيَقْ). فَهْمَا فَهْمَا eryngium planta (gall. pani-
caut). فَهْمَا فَهْمَا spina aegyptiaca ; malogranatum vel
ejus flos.

دَحِيٌّ et **فَحِيٌّ** f., pl. **دَحِيَاتٍ**,
heb. **דַּהֵי** et ar. **كَدِيْ**, jecur; trop.
ira. **دَحِيٌّ مَهْيَنٌ** amaro
jecore: cum vehementi ira.

Pa. حَدْبٌ *v. denom., irritavit, exacerbavit. Usitatur in part.*
حدّبٌ *ira, odio flagrans.*

Ethpa. اِرْدَجْ iratus est; odio fuit.

فَدْرٌ iracundia.

فَجُنْ iracundus.

فَجْسٌ hepaticus.

جَهْرٌ dolor vel ulcerus jecoris.

دَحَّ, fut. **دَحَّمْ** constrin-

xit, ligavit ; *cfr. ar.* *كَبَنْ* *id.*
Ethpe. **أَعْصَلَ** *pass.*
Pa. **فَحَّ** fortiter constrinxit,
 in catenas conjecit.
دُحَّلٌ, *pl.* **دُحَّلٌ** ligamen, vinculum; annuli *seu* ornamenta erurum (*ar.* **خَلَّا** **خِيل**).
دُحَّلٌ vinctio.

دَحَّ *et* **دَحَّ**, *fut.* **تَحَّدَّ** *et* **تَحَّدَّمٌ** cinctus, induit. *Part.* *pass.* **دَحَّسٌ**, **دَحَّسٌ**; *adj.* densus. **دَحَّسٌ** **دَحَّسٌ** sacco indutus.
Ethpe. **أَعْصَلَ** *pass.* *et reflex.*
Aph. **أَدْحَمَ** induere fecit ; cinctus, vestivit *c. acc.* *vel* **كَوْ** *pers.* *et acc.* *vel* **مِنْ** *rei.*
دَحْتَرٌ *et* **دَحْتَرٌ** cinctio, cingulum ; *it. ut* **دَحْتَرٌ** *دَحْتَرٌ* perizoma ; femorale.
دَحْتَرٌ, *pl.* **دَحْتَرٌ**, **دَحْتَرٌ**, pallium, monachorum habitus. **دَحْتَرٌ** **دَحْتَرٌ** mantile.
دَحْتَرٌ superhumерale ; perizoma.
دَحْتَرٌ placenta.
دَحْتَرٌ cinctio.

دَحَّ *inuisit.* ; *cfr. ar.* **دَحَّ**.
id. q. **دَحْتَرٌ** *q. videoas.*

دَحَّ, *fut.* **تَحَّدَّ** multiplicatus est ; *trop.* numero, potentia

superavit, *cfr. ar.* **كَبَنْ** *magnus factus est.*
Ethpe. **أَعْصَلَ** *id.*
Aph. **أَدْحَمَ** crescere fecit, auxit ; crevit.
دَحَّةٌ augmentum, multiplicative.
دَحَّةٌ *id.* ; alveare, *cfr. ar.* **هَوْلًا**.
دَحَّةٌ, **دَحَّةٌ** multus ; magnus.
دَحَّةٌ *مَدْحَنَةٌ* multiplicatio, magnitudo.
دَحَّةٌ, *pro* **دَحَّةٌ**, favus mellis.
مَدْحَنَةٌ *et* **مَدْحَنَةٌ** magnificans, multiplicans.

دَحَّ *vel cum aleph proshet.*
دَحَّ *et* **أَعْصَلَ** *jam*, forte, forsitan ; olim, aliquando ; tantum, utique. **دَحَّ ؟** etiamsi forte, nisi forsan. **دَحَّ ؟** *jam* forte. **دَحَّ ؟** *دَحَّ ؟* quod forte ; *cfr. partic. arab.* **رَبْعًا**, **رَبْعًا**.

دَحَّةٌ *et* **دَحَّةٌ**, *heb.* **غَدَرِيَة**, sulphur ; alcalina planta.

دَحَّةٌ *et* **دَحَّةٌ** sulphureus.

دَحَّ, *fut.* **تَحَّدَّمٌ**, *ar.* **كَبَسَ**, pedibus calcavit ; pressit, oppressit, allisit *c. acc.* *rei vel كَوْ* ; aravit ; mensem, annum intercalavit ; *trop.* subjugavit, in suam potestatem rede-

حَفَعْ مُبَيِّدًا git, cepit; vicit; vel حَفَعْ حَلَا مُبَيِّدًا expugna-
vit urbem. حَفَعْ حَسْلَا condivit in aceto. حَفَعْ كُبَّة فَهْفَة argen-
tum sibi surripuit. Part. pass. حَفَمْ, حَفَعْ; adj. do-
mitus, cicur; subst. servus. حَفَمْ مَعْدَمْ حَفَمْ dies intercalaris.
حَيْدَا حَمَدَا annus bissextilis. Ethpe. اَخْفَى pass; اَسْلَا مَهْفَعْ exercitus insuperabilis.

Pa. **فَذَّ** subegit, domuit
equum, etc.; ; cicuravit.

Ethpa ادھا pass.

Aph. أَحْمَدْ sedere fecit.

فَحْمًا subjugatio, expugnatio.
فَحْمًا, heb. שָׁבֵב, ar. كَنْش, aries,
 vervex; succus sinapis *herba*;
 pulmentum ex molito frumento factum.

حُمْرًا subjugatio; expugnatio;
it. ut seq.

فَحْمٌ *vel* **دُحْمٌ** fusus muliebris;
cfr. **فَحْمٌ**.

فَدْهَمْعًا *vel* **فَدْهَمْعًا** *incubo; cfr. ar.*
كَابُوسٌ; *in pl. placenta casei recentis.*

حَمْفَأٌ subjugatio; servitus.
حَمْفَأٌ calcatus, pedis vesti-
gium; scabellum; pl. **حَمْفَأٌ**
sedile.

فَهُمْ subjugatio.

وَبِعَمَّا وَفَحَّا animæ corporis que subactio.

فَهُمْ expugnabilis, pervius; domitus, mitis.

كَاغِد, pers.-ar. **كَاغِد**, charta.

C, ex et *relativo*, quod,

chald. בְּדַבֵּר, *particula indicans:*
 1° *tempus vel statum:* quum,
 quando, dum, (*ar.* אֲזֶה) حَسْبَهُ
 intuitus est Jesum
 dum ambulabat, seu ambu-
 lantem. فَلَمَّا يَرَى فَلَمَّا
 currendo. مَنْ يَرَى مَنْ يَرَى
 habeat. مَنْ يَرَى مَنْ يَرَى
 cæcus.

فِي مَسْكٍ vivus; crudus.
فِي مَسْكٍ مُّحْكَمٍ scriptus. **فِي مَسْكٍ** ex quo.

لَوْلَى nolens, invitatus. Res-

ponet tere adiuvio asori. et efformat phrases nominales :
بِلَامَهْمَهْ non lotis manibus.

^{2º} pronom. reflex. vel identitatem, si inter pronomina interponatur. ○○ idem, ipse, ipsemēt. ○○ حِينَما codem anno. ○○ مُنْذَهٌ ejusdem. ○○ حَسْنَةٌ dixit suo ipsius socio. ○○ مُنْدَهٌ ex eodem corpore; cfr. alia sub ○○ .

3º *particula concessiva, speciatim c.* ﴿ : ﴽ ۻ ۳ quam-

vis, licet, tamen. جَلْ لَا etsi non.
 فَبِهُ , ex فَ بِ et ۰۰ , sufficit, satis
 est, hucusque ; cfr. ar. قَدْ ,
 فَهُوَ حَتَّى . قَطْ sufficit nobis .
 كَمْ jam satis est de
 his rebus. مَنْدَهُ vel مَنْدَهُ jam, nunc jam, jampridem ;
 statim, continuo. مَنْ وَلَا مَدَهُمْ
 ۰۰۰ qui autem
 non credit, jam judicatus est.
 فَبِا inusit. ; cfr. ar. كَمْ contraxit
 plantam frigus.
 مَنْ ۰۰۰ vel مَنْ ۰۰۰ complicatio,
 contortio ; claudicatio.

جَبَّ , inus. in Pe.; cfr. heb.
 جَذَبْ , ar. كَذَبْ mentitus est.
 Part. præs. فَبَحْ mentiens.
 Pa. فَبَحْ mentitus est, fefellit,
 seq. ت pers. falsitatis arguit,
 fidem erga aliquem violavit.
 Part. pass. مَدَهُ , مَدَهُ ;
 adj. falsus.
 Ethpa. فَبَحْ mendax inventus
 est ; pejeratus est ; deceptus
 est.
 Aph. فَبَحْ mentiri fecit.
 فَبَحْ , فَبَحْ , pl. فَبَحْ
 mendax, impostor,
 falsus.
 فَبَحْ falso, mendaciter.
 فَبَحْ mendacium. فَبَحْ et
 pseudoprophetæ.

مَحْجَمًا falsitas.
 مَهَدْ حَتَّى mendax, mendacii ar-
 gutus.
 فَبِهُ - cfr. ar. كَدْ laboravit,
 defatigatus est.
 Aph.. فَبَدْ complicavit, con-
 torsit.
 فَهَوْ دَلْ dolor puerperæ cum
 fluxu sanguinis; al. secundæ.
 فَهَوْ , pl. فَهَوْ لَا puerpera ;
 obstetrix.
 فَعْوَسْ obsonium cum aceto
 paratum ; capparis ; cfr. ar.
 كَامِهٌ et pers. كَامِهٌ .
 فَبَرْ , fut. فَبَرْ junxit, sub-
 jugavit ; trop. in servitutem
 redegit ; subjicit legi, tribu-
 to. فَهَنْ jejunio
 corpus suum domuit.
 فَبَرْ مَهَدْ currum suum
 instruxit. Part. pass. فَبَرْ ,
 فَبَرْ captivus, servus factus.
 Ethpe. فَبَحْ pass. ; trop. ma-
 trimonii vinculo junctus est.
 فَبَرْ frumentum expurgatum.
 فَبَرْ subjugatio, subjectio ; it.,
 sed al. فَبَرْ , urceus collo
 angustus.
 فَبَرْ et فَبَرْ laguncula collo
 angusta.

كَوْنَتْا et كَوْنَتْا , ar. كَوْنَتْا , pl. كَوْنَتْا , mulus ; f. كَوْنَتْا , pl. كَوْنَتْا mula ; trop. agger, vallum.
مُلِينُسْ mulinus.
جُوْجَبْتَا jugo subjectus.

حَبَّةٌ , fut. حَبَّةٌ infirmatus est ; fatigatus est, torpuit membrum; cfr. ar. حَبَرْ ; it. turbatus est ; cfr. كَدَرْ et heb. טַבֵּד turbidus fuit.

Pa. فَبَوْ infirmavit, debilitavit.

فَلَوْهْ crudele facinus.

فَلَوْهْ loquax, blaterator.

فَبَمْنَا , فَبَمْنَا infirmus, fessus ; multus ; cfr. ar. كَثِيرْ .

فَبَمْنَاتْ infirmitas.
فَبَهْوَهْ vultur ; cfr. ar. كَنْدَرْ , aquilæ species.

فَبَهْوَهْ dysenteriæ species.

فَهْيَ et فَهْيَ , v. s. بَهْيَ .

فَهْيَ اتْكَ et فَهْيَ اتْكَ كَهْلَانْ , labia.

فَهْيَ امْلَهْ وَهْ خِيلَانْ خِيلَانْ , torrens hiemalis.

فَهْيَ كَهْنَدْ et فَهْيَ كَهْنَدْ خِيلَانْ خِيلَانْ , hirundines.

فَهْيَ كَهْنَدْ خِيلَانْ خِيلَانْ , chelidonium planta ; crocus sativus.

صَفَنْ , صَفَنْ sacerdos, presbyter ; cfr. heb. כָּהֵן id. et ar. كَاهِنْ , divinator, sacrificator.
صَفَنْ وَقَنْ مَهْلَفْ vel صَفَنْ مَهْلَفْ Leviticus.

Pa. فَهْيَ v. denom. sacerdos factus est ; sacerdotio functus est ; consecravit ; sacerdotem ordinavit ; per extens. ministerio travit diaconus ; ministerio sacro functus est.

Ethpa. كَهْلَانْ consecratus est, de persona , de re immolata ; abundavit, dives fuit ; excelluit. كَهْلَانْ كَهْلَانْ scientia floruit.

Aph. كَهْلَانْ immolavit victimam.
هَدْنَانْ كَهْلَانْ sacerdotaliter.

فَهْيَ اتْكَامْ sacerdotium ; coll. sacerdotes. كَهْلَانْ لَهْلَانْ Pontificium, Summum Sacerdotium. كَهْيَ أَمْبَأْ وَهْيَ اتْكَامْ ordinem sacerdotalem accepit. كَهْيَ أَمْبَأْ وَهْيَ اتْكَامْ ordinans.

فَهْيَ اتْكَامْ sacerdotalis, sacer.

فَهْيَ دَهْنَانْ os sacrum. فَهْيَ دَهْنَانْ ordinatio sacerdotalis.

فَهْيَ دَهْنَانْ vasa sacra.

فَهْيَ دَهْنَانْ hieroglyphica.
فَهْيَ دَهْنَانْ hierophantes.

فَهْيَ اتْكَامْ sacerdotalis.

أَبْعَدْتُ ، دَمْنَلْتُ abundantans, fertilis ; plenus, dives ; magnificus, florens. أَرْبَدْتُ ، دَمْنَلْتُ Arabia Felix. أَرْبَدْتُ ، دَمْنَلْتُ حَتَّى regio ecclesiis florens. دَمْنَلْتُ حَسْكَمْا paganismo deditus.

أَبْعَدْتُ ، دَمْنَلْتُ abundantia, fertilitas ; prosperitas.

أَهْمَدْتُ sacerdotium ; munus sacerdotale ; consecratio, consecratio episcopi ; inde sacra celebratio mysteriorum ; ritus, cæremonia. بِنْهَنْتُ فَهْلَكْتُ filius consecrationis : patriarcha, episcopus.

أَبْعَدْتُ ، دَمْنَلْتُ abundantans, dives.

أَسْتَوْدَتُ consecratorius, ad consecrationem vel sacerdotium pertinens ; sacra vel ministerium sacrum peragens.

أَسْتَوْدَتُ ، مَدْنَلْتُ sacerdotium, ministerium sacerdotale.

أَسْتَوْدَتُ ، مَدْنَلْتُ sacris ordinibus auctus.

أَسْتَوْدَتُ ، مَدْنَلْتُ consecratio.

أَهْجَرْتُ — cfr. حَذَرْتُ et ar. كَهْرَزْتُ objurgando expulit.

Ethpa. حَذَرْتُ ، دَنْدَلْتُ objurgatus est.

أَهْجَرْتُ ، pers. - ar. كَهْرَنْتُ stipulas attrahens : succinum, elec-trum.

أَهْجَرْتُ ، fut. نَحْمَدْتُ , ar. كَهْرَى , cauterio ussit. Part. pass. دَهْنَلْتُ .

Pa. دَهْنَلْتُ adussit, cauterizavit ; trop. incendit cor.

Ethpa. دَهْنَلْتُ pass.

أَهْجَرْتُ ، دَهْنَلْتُ adustio ; cauterium.

أَهْجَرْتُ ، دَهْنَلْتُ pœnitentia.

أَهْجَرْتُ ، دَهْنَلْتُ et دَهْنَلْتُ ، ar. كَهْرَة , pl. دَهْنَلْتُ ، شَقْة , st. c. فَهْلَكْتُ , foramen, spec. fenestra, fenestrula ; armarium, cista. دَهْنَلْتُ وَهْكَمَا قَهْنَتُ aperturæ secretæ.

أَهْجَرْتُ ، دَهْنَلْتُ et لَهْلَهْ ، vox persica, خَوَاجَه herus, titulus honorificus (gall. monsieur).

دَهْنَلْتُ id. q. دَهْنَلْتُ moeruit.

أَهْجَرْتُ ، دَهْنَلْتُ ، v. s. دَهْنَلْتُ .

أَهْجَرْتُ ، دَهْنَلْتُ ، v. s. دَهْنَلْتُ .

أَهْجَرْتُ ،

أَهْجَرْتُ ، fut. نَحْمَدْتُ se retraxit timide, inde timuit, puduit eum ; religiose declinavit, abstinuit, c. بَهْرَتُ ; verecundus fuit ; cfr. ar. كَزْ se contraxit.

أَهْجَرْتُ ، pudor, verecundia.

أَهْجَرْتُ ، دَهْنَلْتُ ، ar. كَهْرَزْ ، ampulla, urceus ; mensura quædam.

أَهْجَرْتُ et دَهْنَلْتُ caligo.

كُنْزِرَةٌ دَهْدَهْنَا coriandrum, ar. كُنْزِرَةٌ دَهْدَهْنَا id. q. كَهْمَهْنَا .

دَهْدَهْنَا Ethpa. دَهْدَهْنَا palpebras pendentes inversas habuit; strabo fuit.

دَهْدَهْنَا palpebrarum inversio. دَهْدَهْنَا id. ; it. aura lenis; cfr. دَهْدَهْنَا et دَهْدَهْنَا .

دَهْدَهْنَا cui palpebra inferior pendens est et invertitur.

دَهْدَهْنَا , id. q. دَهْدَهْنَا .

دَهْدَهْنَا دَهْدَهْنَا , et دَهْدَهْنَا f. cista, arca; دَهْدَهْنَا بَوْسَ navigium Noe; cfr. γῆλός arca.

دَهْدَهْنَا vel دَهْدَهْنَا , pers. دَهْدَهْنَا , كَوْكَةٌ , كَوْكَةٌ , ar. كَفْكَةٌ , placenta.

دَهْدَهْنَا , pl. دَهْدَهْنَا , دَهْدَهْنَا , deriv. a دَهْدَهْنَا , stella, asteriscus. دَهْدَهْنَا , دَهْدَهْنَا stella terræ: lapis amiantus.

دَهْدَهْنَا دَهْدَهْنَا stella sanguinis: lapis haematis. دَهْدَهْنَا مَبْتَسَ Venus stella, al. Canopus.

دَهْدَهْنَا دَهْدَهْنَا Mercurius planeta. دَهْدَهْنَا دَهْدَهْنَا stella matutina. دَهْدَهْنَا دَهْدَهْنَا luminis stella: Christus. دَهْدَهْنَا vel دَهْدَهْنَا Jupiter stella, heb. دَهْدَهْنَا . دَهْدَهْنَا planetæ. دَهْدَهْنَا دَهْدَهْنَا nebulosæ stellæ.

دَهْدَهْنَا دَهْدَهْنَا cometa; cfr. ar. كَرْخَبَ دَهْدَهْنَا ,

et heb. دَهْدَهْنَا stella, a rad. inus. دَهْدَهْنَا , ar. كَهْ مَهْ volvit.

دَهْدَهْنَا stella Veneris.

دَهْدَهْنَا et دَهْدَهْنَا dim., stellula; asteriscus.

دَهْدَهْنَا denom. stellis ornavit; asterisco insignivit.

Part. pass. دَهْدَهْنَا stellifer, stellis distinctus, asterisco notatus.

Ethpalp. دَهْدَهْنَا stella factus est; stellæ similis fuit, ut stella fulsit.

دَهْدَهْنَا stellaris.

دَهْدَهْنَا et دَهْدَهْنَا nycticorax, bubo; erodius.

دَهْدَهْنَا دَهْدَهْنَا turbo; pruina, nix abundans, pl. دَهْدَهْنَا ; cfr. دَهْدَهْنَا .

دَهْدَهْنَا inus.; cfr. heb. دَهْدَهْنَا , ar. كَلْ mensuravit.

Alph. دَهْدَهْنَا mensus est frumentum, etc; determinavit.

Ethpe. دَهْدَهْنَا mensuratus est. دَهْدَهْنَا mensura, quantitas; metrum, modius; gramm. paradigmata, conjugatio, forma modus; componitur دَهْدَهْنَا c. variis particulis دَهْدَهْنَا , دَهْدَهْنَا et contrahitur in دَهْدَهْنَا , v. g.: دَهْدَهْنَا hoc modo, tune; دَهْدَهْنَا adhuc; دَهْدَهْنَا exinde; cfr. has particulas.

مَتْهَا, *pl.* **مَتَّهَا**, **مَتَّهَادًا**, **مَتَّهَاداً** men-
sura; metrum; vas unguen-
tarium; lectica.

فُكْهَمٌ tenuitas; solutio, relatio.

دَلْلَى mensurator.

لِكْتَافٌ lectica muliebris ; men-
suratio.

فَمَدِّهُ prominentia, v. s. **فَلْ**.

مُحْكَمٌ mensurator.

مَدْعَى مَفْكُورٍ mensurabilis; mensura venditus. **مَدْعَى مَفْكُورٍ** res mensurabiles. **مَدْعَى مَفْكُورٍ** innumerus, impensus.

الْمَدْلُوْلَاتُ mensurabilitas.

ମାଦ୍, v. s. ଲ୍ଲୁ .
ଲ୍ଲୁମାଦ୍ succus lini seminis.

دَمْكُنْا، دَمْكَنْا وَأَوْلَا، دَمْكَنْا وَأَوْلَا et
cholera morbus.

فَمَكْوَه γυλός, chylus; succus
cibi; phlegma.

፩፻፷፭ γዕለት, bilis, fel.

כָּמֹר, fut. **נִתְּחַזֵּק** abscondit,
recondidit, obruit, invasit, c.
לִזְבַּח; trop. destruxit, vicit; it.

لَا قُصْدَرْ لَهُمْ a laudibus
non cessavit.

فِعْلًا *id. q. seq.*

լառով, it. լառաց occultatio;
dolus, insidiae.

جَهْمُ insidiator.

فَأَمْلَأْتُهُنَّا et دَامَدَنْر dolose agens, insidians.

عَصْمَانٌ et **عَصْمَانَ** **جَعْمُونَسُ**, *pl.*
عَصْمَانٌ et **عَصْمَانَ** **chymus**; hu-
 more, succi.

حَفَّ ، fut. بَعْثَمْ ، ar. كَانَ ، extit-
 tit, fuit; factus est; cœpit
 exstare, accidit; impers. حَفَّةٌ
 accidit. Part. præs. حَفَّاً ، حَفَّةً;
 Part. pass. adject. usurpat.
 حَفَّاً ، mng. c. l prosth. حَفَّاً ،
 pl. f. حَفَّاتٍ ، حَفَّةٌ rectus, fir-
 mus, speciat. justus. حَفَّاً كَـ
 وَنُـهـا أـحـدـهـ فـتـنـا nos dignos efficias
 ut inter justos habitemus;
 it. impers. decent, convenit.
 حَفَّاً لـا حـمـارـهـ dicere non decent.

Ethpe. ﴿كَلْمَة﴾ creatus est, natura dispositus est *in tali statu*; accidit.

Pa. exstare fecit, format, indidit, constituit. *Part.*

pass. حَدَّثَنَا ، حَدَّثَنَا ; *adj.* aptus.
Ethpa. ظَاهِرٌ exstitit, evenit,
occurrit ; a Deo formatus est ;
aptatus est, convenit.

Aph. أَفْ fecit ut existeret,
creavit; constituit, dispositus;
trop. polivit. أَكْتَأْ أَصْ حَدَّهُ
الْمَوْلَى مَنْ لَا يَمْلِكْ Deus mundum con-
didit a nihilo. *Part. pass.*
مَحْتَأْ، مَحْضٌ ; *adj.* naturalis ;
capax, *rei c.* ; aptus ad, *c.*
﴿ ; possibilis ; extans. ﴿ مَمْتَهَنٌ
مَحْضٌ، بِلَا مَحْضٍ quod est contra na-
turam.

فَتْنَةٌ , pl. فَتَّنَاتٍ , فَتَّنَةٌ , فَتَّنَةٌ , فَتَّنَةٌ
 natura, indoles nativa ; es-
 sentia, substantia; ap. gram.
 substantivum; proprietas na-
 turalis; pudenda ; -c., adj. وَفَتَّنَةٌ
 naturalis ; physicus. حَدَّا وَفَتَّنَةٌ
 filius naturalis, filius consub-
 stancialis. حَدَّا وَفَتَّنَةٌ tempus pro-
 creationis. مَهْمَةٌ فَتَّنَةٌ f. حَمَدَةٌ
 فَتَّنَةٌ consubstantialis. اَوْسَطٌ فَتَّنَةٌ
 Diophysitæ. ; c. præp. حَدَّةٌ مِنْ فَتَّنَةٌ
 præternaturalis ; حَلَّةٌ مِنْ فَتَّنَةٌ
 supernatura-
 lis.

حَتَّىٰ naturaliter.
حَتَّىٰ naturalis, physicus; ele-
 mentaris, innatus, nativus,
 substantialis; *subst.* natura-
 lista; *pl. m.* **حَتَّىٰ**, *f.*
حَتَّىٰ res naturales seu
 physicae. **حَسْنًا** **حَتَّىٰ** germanus
 frater. **هُدْخُنًا** **حَتَّىٰ** scientia
 physica. **حَكَمَ** **حَتَّىٰ** Meta-

physica. دِيُوفِيْسِيْكَا Diophy-
sitæ.

حَمْنَةٌ natura, substantialitas.

فِي الْجَسَدِ الْمُعَلَّمَةُ فِي الْجَسَدِ physiologia.

اِلٰهُ مُحَمَّدٌ consubstantialitas.

مَهْمَلٌ, adductio ad existentiam; **casus**, accidentis; **trop.** successus.

جَمِيعاً، دُمْنَا rectus, firmus, v. sub
Pegl.

جَانِمٌ, *nng.* **جَانِمٌ** *juste,*
recte

مُخْلِّقٌ creator.

مَحْتَاجٌ naturaliter.

مَحْدُودٌ naturalis.

الـ مـحـكـمـاـتـ possilitas, dispositio,
facutas, capacitas ; الـ مـحـكـمـاـتـ impossibilitas.

مُخْتَيْلًا vis potentialis.

جَاهِدٌ dispositus, capax.

نَوْرٌ مُّهَاجِرٌ natura ; ratio naturalis, capacitas.

فُم *γοῦς, γοῦν*, *congius mensura.*

μαστήγων, infundibulum molæ ;
fiscella.

فُوْنَا nucleus seminis *herbæ.*

فَهُوَ، *vide* فَلَاهُ.

جَهَنَّمَ vox lat. comes, titulus dignitatis (gall. comte).
 جَهَنَّمَ , ar. حُنْدُسْ , struthion planta (gall. saponaire).
 جَهَنَّمَ γύρός , spelta, alica (gall. épeautre).
 جَهَنَّمَ κέρατος et جَهَنَّمَ κέρατος chondrille (gall. condrille).
 جَهَنَّمَ γύγηνος , catinum ad metalla liquefacienda.
 جَهَنَّمَ , pl. حَمَّامَاتْ et حَمَّامَاتْ γυγνίτης , bilibris mensura.
 جَهَنَّمَ κυνάρα , cynacantha (gall. églantier); cfr. حَمَّامَاتْ .
 جَهَنَّمَ f. , pl. pler. in pl. حَمَّامَاتْ et حَمَّامَاتْ spelta, zea.
 جَهَنَّمَ , nnq. حَمَّامَاتْ , contr. comp. ex. حَمَّامَاتْ , basis et حَمَّامَاتْ umbilicus, ar. سُرَة ; it. contr. حَمَّامَاتْ , et حَمَّامَاتْ apertura umbilici, umbilicus.
 جَهَنَّمَ vel حَمَّامَاتْ coriandrum, ar. كَزِيرَة .
 جَهَنَّمَ γύρος , γύρος , pulvis ; nomen mensuræ.
 جَهَنَّمَ , imp. v. بَحْص .

و

جَهَنَّمَ fut. بَحْص circumrodit.
 Part act. فَاعِل .

جَهَنَّمَ , pers. كَوْسَاتْ , tympanum (gall. tambour).

جَهَنَّمَ , pers. كَوْز seu gibbus, fornix.

جَهَنَّمَ et حَمَّامَاتْ , حَمَّامَاتْ gibbosus, arcuatus.
 لَهَنَّمَ id. q. حَمَّامَاتْ .

كَافِسْ , heb. כָּוֹסْ ar. calix ; constellationis nomen ; trop. sors.

جَهَنَّمَ it. حَمَّامَاتْ et حَمَّامَاتْ vinarium, lagena.

كَتِيجْ حَمَّامَاتْ , pers. حَمَّامَاتْ , cingulum, zona.

جَهَنَّمَ articulus, os parvum carpi.

جَهَنَّمَ , fut. بَحْص incurvavit, flexit. Part. pass. فَاعِل , cfr. حَفْعَ .

جَهَنَّمَ inflexio, sinuositas.

جَهَنَّمَ pl. حَمَّامَاتْ calix florum vel spec. floris maligranati.

جَهَنَّمَ حَمَّامَاتْ urceus ore angustus.

حَمَّامَاتْ id. q. حَمَّامَاتْ , v. s. فَاعِل .

جَهَنَّمَ , ar. كُورْسْ , fornax ; follis fabri ferrarii, catinum ; corus mensura decem bathos continens, heb. כָּוֹסْ , ar. كَوْز .

Ethpa. حَمَّامَاتْ verb. den., sicut fornax fuit, inde excanduit ; trop. iratus est e. حَمَّامَاتْ vel حَمَّامَاتْ pers.; erubuit; cfr. حَمَّامَاتْ .

جَهَنَّمَ et حَمَّامَاتْ aestus suffocans ; caligo; siccitas. حَمَّامَاتْ وَكَوْزْ calidus mensis Julii.

<i>Ethpalp.</i>	أَفَمْهَفْ	verb. den.
	أَسْتُعَاوِيْتِ	aestuavit.
أَرِيدُ	أَرِيدُ	aridus.
أَلْفَارَة	أَلْفَارَة	alveare apum, ar. خوارة.
أَنْدَنَا	أَنْدَنَا	<i>id.</i>
أَرِيْج	أَرِيْج	et أَرِيْج , أَرِيْج , f. γύρων, ar.
أَرِيْج	أَرِيْج	, pl. خَرَزَة, regio, ager.
أَرِيْج	أَرِيْج	أَرِيْج , ar. خُوري , curatus;
		chorepiscopus, pl. أَرِيْج .
أَرِيْج	أَرِيْج	أَرِيْج ؛ أَرِيْج مَهْمَهْفَا
		χορεπισκόπος, chorepiscopus.
أَرِيْج	أَرِيْج	أَرِيْج et مَخْنَأْ fascis in dorso portandus, ar. كاره , a rad. شَارَ
		involutus.
أَرِيْج	أَرِيْج	أَرِيْج mensuræ nomen.
أَرِيْج	أَرِيْج	, pl. أَرِيْج χορός , chorus canentium ; chorus
		Angelorum.
أَرِيْج	أَرِيْج	أَرِيْج دَهْنْهَهْ , foenum.
أَرِيْج	أَرِيْج	أَرِيْج دَهْنْهَهْ coctus ; pulmentum.
أَرِيْج	أَرِيْج	, v. s. دَهْنْهَهْ .
أَرِيْج	أَرِيْج	, fut. بَقْمَهْ quievit,
		أَرِيْج حَمْدَهْ substitut in loco.
		أَرِيْج domi remansit quietus.
أَرِيْج	أَرِيْج	<i>Pa.</i> أَرِيْج quiescere fecit.
أَرِيْج	أَرِيْج	أَرِيْج quies, vita quieta, soli-
		taria; vita monastica.
أَرِيْج	أَرِيْج	fusus ; cfr. دَحْمَهْ .
أَرِيْج	أَرِيْج	quietus.
أَرِيْج	أَرِيْج	et مَلَأْهَهْ objurgatio,
		repulsio ; cfr. دَفْ .

أَرِيْج	أَرِيْج	, pers. خُونس آب , liquor ex variis fructibus simul concoctis expressus.
أَرِيْج	أَرِيْج	, pers. خَشَّة , ar. خَرَسَة ervum, ervilia planta, (gall. ers).
أَرِيْج	أَرِيْج	أَرِيْج sieut ; cfr. لَهْلَهْ .
أَرِيْج	أَرِيْج	أَرِيْج .
أَرِيْج	أَرِيْج	أَرِيْج obsonium cum aceto confectum ; placenta ; cfr. لَهْلَهْ .
أَرِيْج	أَرِيْج	أَرِيْج , v. دَهْنَهْ .
		أَرِيْج inus. ; cfr ar. حَرْج se contraxit. Part. دَمَّا tremore.
		Palp. دَهْنَهْ strenue dimicavit.
		أَرِيْج nativi indigenæ.
		أَرِيْج , ar. كُرْنَرَة, coriandrum.
أَرِيْج	أَرِيْج	أَرِيْج asper, durus ; cfr. مَهْمَهْ .
أَرِيْج	أَرِيْج	أَرِيْج asperitas.
أَرِيْج	أَرِيْج	أَرِيْج دَمَّا , pers. دَمَّا , athleta, heros, cfr. لَهْلَهْ s. دَهْنَهْ .
أَرِيْج	أَرِيْج	أَرِيْج strenuitas, fortitudo.
أَرِيْج	أَرِيْج	أَرِيْج دَمَّا durus, ferox.
		أَرِيْج veritus est, erubuit e. دَهْنَهْ ; modestus fuit.
		Part. pass. حَسْبَأْ , حَسْبَأْ .

<i>adject.</i> <i>usurp.</i> reverendus ; verecundus, modestus.	فَهْسُلٌ <i>id.</i>
<i>Pa.</i> فَهْسِبْ ruborem, pudorem injectit.	مَحْسِلٌ stylus <i>seu</i> instrumentum ad inungendos oculos.
<i>Ethpa.</i> فَهْسِبْ <i>pass.</i>	فَهْسَنْ fumus interclusus.
فَهْسِبْ pudor.	
فَهْسِبْأَنْ, فَهْسِبْأَنْ, <i>f. emph.</i>	
فَهْسِبْأَنْ pudibundus.	
فَهْسِبْأَنْ <i>id.</i>	
فَهْسِبْهَا verecundia.	
لَا مَهْدَفْسِبْنَ مَهْدَفْسِبْنَا verecundus ; مَهْدَفْسِبْنَا impudens.	
مَهْدَفْسِبْنَا cum pudore.	
لَا مَهْدَفْسِبْنَا مَهْدَفْسِبْنَا impudenter.	
مَهْدَفْسِبْنَا pudor ; c. ۰, impudentia.	
فَهْسِبْ , fut. فَهْسِبْ spiravit ; flavit. Part. act. فَهْسَ . cfr. فَهْسِ .	فَهْسِلٌ et دَمْلٌ γιάχη, ita vocatum ab insula Chio, mastix, mastiche
Aph. فَهْسِ insufflavit, exhala vit ; flatu movit.	دَمْدَلٌ , v. s. فَهْسِلٌ , فَهْسِ syngrapha ; rationarium.
فَهْسِلٌ vel فَهْسِلٌ insufflatio ; aura, halitus.	دَمْدَلٌ γαῦμα, aestus.
	فَهْسِنْ γιών, nix.
فَهْسِنْ , fut. فَهْسِنْ stibio vel fuco sublevit ; excæcavit.	فَهْلٌ , v. s. فَهْلٌ .
<i>Ethpe.</i> فَهْلِسْ <i>pass.</i>	فَكْلَفْ id. q. فَكْلَفْ .
فَهْلٌ et فَهْلٌ كَخْلٌ , ar. stibium, collyrium.	فَكْلَبْهَةَ تَسَا γελιδόνιον , chelidonia planta (gall. éclaire).
فَهْلٌ qui oculos stibio pingit.	فَكْلَتْدَلٌ γιλίκρυχος , chiliarcha, tribunus.
فَهْلٌ stibii venditor.	
فَهْلِكْمَاءَ et فَهْلِكْمَاءَ actio liniendi stibio.	

فَلْدَا , v. s. لـ .

فَسَدَا heb. כְּרִבֵּה Pleiades, cfr.

فَعْ ; it. tuber, ar. كَنَّةٌ .

فَسْخَا et فَعَدَا chimia ; cfr.

χύμεια , et ar. كَيْوِيَّةٌ .

فَصَدَّهـ مـ صـ χύμαρος , chymus.

فَصَدَّهـ مـ صـ ad chymum spectans.

فَصَدَّهـ مـ صـ χύμευσις , tumor in palpebris.

فَصَدَّهـ نـ , et deriv. v. s. فـ .

فَسْخَا , v. s. فـ .

فَلَاتِا i verb. denom., ordinatio nem, consecrationem accepit.

فـ , ex ψ et δή , particula enclitica et declarativa: nempe, nimirum, scilicet, etiam; فـ tunc, igitur ; . . . o . . . فـ tum . . . tum . . . ; æquivalet etiam particulis τέ , δή , γέ ῥν ; cfr. فـ هـ et فـ هـ .

فـ dens molaris.

فـ vel فـ gallina.

فـ دـ دـ دـ , al. فـ دـ دـ دـ libum, placenta ; pilulae medicæ ; cfr. لـ .

فـ دـ دـ دـ , pl. فـ دـ دـ macula distinctus ; in pl. placenta, pilulae. نـ دـ دـ دـ panthera maculosa.

فـ دـ دـ دـ , f. فـ دـ دـ albo et nigro variegatus.

فـ دـ دـ دـ , f. id.

فـ دـ دـ دـ , et فـ دـ دـ .

فـ دـ دـ دـ rhombus piscis (gall. turbot) ; pl. فـ دـ دـ infima pars dorsi. cfr. فـ دـ دـ .

فـ دـ دـ دـ , f., pl. فـ دـ دـ talentum ; trop. ingenium, facultas, donum ; cfr. فـ .

فـ دـ دـ دـ ad talentum pertinens.

فـ يـ يـ يـ , manus.

فـ نـ نـ نـ et فـ نـ نـ نـ , plerumque in st.

c. لـ فـ , et in comp. cum آبـ اـ

vel آبـ اـ فـ نـ فـ فـ chirographum, subscriptio propria manu.

فـ نـ نـ نـ et فـ نـ نـ نـ , فـ نـ نـ نـ ,

pl. فـ نـ نـ نـ , γειροτονία , impositio manuum, ordinatio, consecratio.

فـ نـ نـ نـ γειροτονητός , ordinatus ; it. ordinatio.

فـ نـ نـ نـ γειροτονηθείς , ordinatus, electus.

consummatus in brevi explavit tempora multa ; it. martyrio coronatus est.

مَكْلُومٌ, ar. إِخْلِيلٌ, corona; fascia; coronarium aurum; trop. benedictio nuptialis; coetus. **مَهْوَبٌ مَكْتَلٌ** *benedictio coronarum*: ritus nuptialis, **مَكْلَمٌ أَمْهَمٌ** *corona victoriae*: martyrium. **مَكْلُومٌ وَسَتَّا** et **مَكَّلَمٌ** *id. id. صَدَمٌ* **مَهْوَبٌ** *corona domus*: pinni murorum. **مَكْلُومٌ وَأَحْمَقَتَّا** *corona discipulorum*: coetus audientium. **مَكَّلَمٌ وَصَدَمٌ** *vel* **مَهْوَبٌ** *corona borealis constellatio vel australis.* **مَكَّلَمٌ مَكْلُومٌ** melilotus herba.

مَكْنُونٌ ad coronam pertinens, **مَهْرَبٌ** coronarius; complementum; trop. nuptiae; mors Beatorum, spec. martyrium.

مَكْلَمٌ prominentia; cfr. **فَلَةٌ**. **مَكَّلَمٌ**, pl. **مَكْتَلٌ** velum, conopeum; linteum; pallium; cfr. **مَلَلٌ** s. **مَلَلٌ**; -; **مَكَّلَمٌ** *et* **مَكَّلَمٌ** anemone coronaria.

مَكْلُومٌ, st. c. **مَكَّلَمٌ**, pl. **مَكَّلَمٌ**, *it. فَلَكَتَةٌ*, **مَكَّلَمٌ**, nnq. **مَكَّلَمٌ**, quae coronam nuptiale habuit, sponsa; nurus; cfr. ar. **كَنَّةٌ**; *it. præputium.*

مَكْلَمَةٌ dim. *præc.*; anemone. **مَكْلَكْتُرٌ** coronans.

مَكْلَكْمَةٌ coronatio. **مَكْلَكْمَةٌ** opinio.

مَكْلَكْلَمَةٌ perfectio; consummatio, completio.

فَلَلٌ et **فَلَّا**, emph. **فَلَلٌ** et **فَلَّا**, subst. universitas, universum, totum quid; **فَلَلٌ** omnipotens. **فَلَلٌ** *omnipotens. فَلَلٌ* **خَلَقَتَهُ** Creator omnium. **فَلَلٌ** *فَلَلٌ* ante omnia; adj. indecl. omnis, totus, unusquisque : **فَلَلٌ** omnis homo, quicumque. **فَلَلٌ** *id.* **فَلَلٌ** *مَعْنَى فَلَلٌ* **لَكَتَهُ** undeaque. **فَلَلٌ** *لَكَتَهُ* ex omni genere. **فَلَلٌ** *لَكَتَهُ* et **لَكَتَهُ** in omni loco. **فَلَلٌ** *لَكَتَهُ* quovis tempore. **فَلَلٌ** *لَكَتَهُ* quilibet modus. **فَلَلٌ** *لَكَتَهُ* quisque. **فَلَلٌ** *لَكَتَهُ* semper. **فَلَلٌ** *لَكَتَهُ* quævis ratio. **فَلَلٌ** *لَكَتَهُ* qualibet hora. **فَلَلٌ** *لَكَتَهُ* quotidie. **فَلَلٌ** *لَكَتَهُ* totus dies. **فَلَلٌ** *لَكَتَهُ* singulis annis. **فَلَلٌ** *لَكَتَهُ* annus totus. **فَلَلٌ** *لَكَتَهُ* quicunque. **فَلَلٌ** *لَكَتَهُ* quidquid erat. **فَلَلٌ** *لَكَتَهُ* quidquid. **فَلَلٌ** *لَكَتَهُ* quicunque audit; c. aff. **فَلَلٌ**, nnq. **فَلَلٌ** tu omnino. **فَلَلٌ** nos omnes; adverb. **فَلَلٌ** *لَكَتَهُ*

١° *Admirationis, et exclamatio-*
nis: quam! quātus! quan-
tum! **فَعْلًا وَهُوَ مَهْمَنًا** quam ma-
gnus Dominus! **فَعْلًا مَهْمَنًا مَهْمَنًا!**
quam amara est mors! **فَعْلًا**
quam sæpe! quoties!

2° *interrogationis, præs. de*
tempore, quantum ? a quo
tempore ? **فَعْلًا كَمْ وَهُوَ**
quamdudum huc venisti? **كَمْ فَعْلًا**
quoties?

3° *quantitatis et magnitudi-*
nis : **فَعْلًا أَخْرَى** quanti emit ?
فَعْلًا مَلَكِمْ quanto magis.
فَعْلًا وَسَعْمَنْ quantum possu-
mus. **فَعْلًا وَأَمْدَنْ** quantum
in nobis est.

4° *Adhibetur c. var. partic.* **فَعْلًا**
quantum; quum; quoties,
quatenus, quamdiu; **كَمْ**
فَعْلًا كَمْ فَعْلًا quanto ma-
gis. **فَعْلًا بِنَا كَمْ id.**; raro.
فَعْلًا بِنَا quantum.
فَعْلًا مَمْحَسَنْ quantum possunt.
فَعْلًا فَعْلًا quantum.
فَعْلًا, quidquid.
فَعْلًا ... فَعْلًا si... a fortiori.
فَعْلًا ... فَعْلًا quantum... tantum.
فَعْلًا مَهْمَنًا quantumvis resistat.
فَعْلًا, ar. كمية, quantitas,
copia, numerus.

فَعْلًا ad quantitatem spectans,
quantitativus.

فَعْلًا lupus.

فَعْلًا, fut. **نَفَقَ** et **نَفَقَ** emarcuit, exsiccatus est; cfr.
ar. كَوَافِر. Part. pass. **فَعْلًا**,
فَعْلًا marcidus, flaccidus.

Ethpe. **فَعْلًا** flaccidus factus
est; tabuit.

Ethpa. **فَعْلًا** pass. **فَعْلًا** et **فَعْلًا** marcior, putredo.

فَعْلًا, fut. **نَفَقَ**, ar. كَبَيْهِ, cæcus fuit.

Ethpe. **فَعْلًا** id.

Pa. **نَفَقَ** excæcavit.

Ethpa. **نَفَقَ** pass.

Aph. **نَفَقَ** ut *Pa.*; caligine ob-
duxit.

فَعْلًا, **فَعْلًا** et **فَعْلًا** cæcus;
caliginosus.

فَعْلًا cæcitas; caligo.

فَعْلًا velato modo, meta-
phorice.

فَعْلًا caliginosus.

فَعْلًا alchymia.

فَعْلًا et **فَعْلًا** χαμαιλέων,
chamæleon, *lacerta* et *planta*.

فَعْلًا amiculum quo induun-
tur Persæ, pallium.

فَعْلًا, fut. **نَفَقَ** insidiatus
est; machinatus est, c. ↗

pers. ; *cfr.* كَنْ حَمْلًا . كَنْ ini-quas insidias struxit. *Part. pass.* حَمَّلَتْ , فَعَسْ insidians, machinans ; insidiose obser-vans.

Ethpe. حَمْلٌ insidiatus est ; insidiosus fuit.

Pa. حَمْلٌ insidiatus est, ma-chinatus est ; paravit.

Ethpa. حَمْلٌ sæpe insidia-tus est.

Aph. حَمْلٌ , paravit *insidias*; *nnq. absol.* sine حَمْلٍ insidiatus est.

حَمْلَةٌ insidiæ.

حَمْلَاتٌ , *pl.* حَمَّالٌ insidiæ ; insidiatores ; latibula. حَمْلٌ فَعَسْ et حَمَّلَتْ *id.*

حَمَّالٌ insidiose.

حَمَّالَةٌ insidiarum paratio.

حَمَّانٌ insidians ; insidiosus.

حَمَّانٌ insidiatio.

حَمَّانٌ et حَمَّانٌ , it. حَمَّانٌ et حَمَّانٌ insidiosus.

حَمَّانٌ insidiatio.

حَمَّانٌ et حَمَّانٌ κύμιον , ar. كُمُون , cuminum.

حَمَّانٌ e cumino extractus.

حَمَّانٌ capnos planta (gall. fumeterre).

حَمَّانٌ et حَمَّانٌ , حَمَّانٌ γεύμών , *pl.* حَمَّانٌ procella.

حَمَّانٌ procellosus.

حَمَّصٌ , fut. حَمَّصَ marcuit, languit ; *nnq. transit.* ares-cere, marcescere sivit. حَمَّصٌ , pl. حَمَّصَ placenta.

حَمَّةٌ , fut. حَمَّةٌ mœstus fuit.

Part. præt. pro adj. usurp. حَمَّةٌ , حَمَّةٌ tristis, lugubris ; ater, tenebrosus ; iratus.

Ethpe. حَمَّةٌ tristis, mœstus factus est, vultum subduxit ; obscuratus est.

Ethpa. حَمَّةٌ valde contrista-tus fuit, frontem contraxit.

Aph. حَمَّةٌ contristavit ; obscu-ravit.

حَمَّةٌ mœste.

حَمَّةٌ , حَمَّةٌ tristitia.

حَمَّةٌ vel حَمَّةٌ opificium.

حَمَّةٌ , *pl.* حَمَّةٌ sacerdos, sacri-ficator, pontifex, *proprie* tris-tis *sive* propter nigram ves-tem sacerdotum, *sive* ex gra-viori vivendi ratione ; *cfr.* حَمَّلٌ tristis, asceta ; حَمَّةٌ et حَمَّةٌ summus sacer-dos, pontifex.

حَمَّةٌ *f.*, *pl.* حَمَّةٌ minis-trra, *sacrorum moderatrix femina.*

حَمَّةٌ sacerdotium, pontifica-tus.

سَرْفِيَّة *sacerdotalis, pontificalis; pl. f.* **هُرْفِيَّة** *hieratica seu hieroglyphicæ litteræ.*
مَحْصُونٌ *contristans.*

مَحْصُونٌ, *fut.* **تُحَمِّل** emarcuit, exsiccatus est. *Part. præt.* **مَحْصُونٌ**; aridus, marcidus.

Ethpe. **أَدْعَمَ** *id.*

Pa. **مَحْصَنَ** arefecit, exsiccavit.

مَحْصَمَ dessicatio, macies.

مَهْمَهَ qui arescere facit.

مَهْمَهَة *exsiccatio. قَتْرَنٌ* **مَهْمَهَة** contractio vultus, ruga.

مَهْمَهَة acini nucleus, acinus *spec.* uvæ passæ.

مَهْمَهَة *et* **مَهْمَهَة**, *ar.* **كَمَثْرَى** **دَهْمَهَة**, pirum, pirus communis.

فُ, *heb.* **ف** ita, recte, *c. l.* *prosth.* **فُل**, secundum hoc, ita; deinde, postea; **ف**...
ف tum... tum... **فُل** **مَهْمَهَة** exinde, propterea; **فُل** **مَهْمَهَة** quanto minus. **فُل** postea, posteaquam.

حُل - *Inus. in Pe.; cfr. ar.*

كَفَنَ cognominavit.

Pa. **فَتَّ** cognominavit, appellavit; nota quadam designavit, signo notavit. **فَائِزٌ** **أَوْسَعَ** connumeravit eos in-

ter divites.

Ethpe. **أَفْتَلٌ** *pass. et refl.*

Aph. **هَذِئُ** *ut Pa. Part. pass.*

مَحْسِنًا, *f. emph.* **مَحْسِنًا**.

مَهْمَنْ, **مَهْمَنْ** *appellatio, cognominatio; commemoratio; cognomen; nomen; terminus technicus.*

بَنْجَانٌ *وَهَنْجَانٌ* **أَهْنَانٌ** parentes ejus quoad nomen,

i. e. adoptivi. **هَنْ**, *pl.*

هَنْ **هَنْ** eodem cognomine

præditus.

فَلْدَا *m., heb.* **כָּנָה**, ejusdem

cognominis particeps, *inde socius, conservus; f.*, *socia, conserva; par, æqualis, alter;*

similis; pl. **فَلْدَنٌ** *socii, conservi.*

فَلْدَنٌ **وَهَنْجَانٌ** bestiis similes.

هَنْدَنَانٌ *هَنْدَنَانٌ* ad conservos pertinens.

هَنْدَنَانٌ *هَنْدَنَانٌ* sodalitas, collegium.

مَهْمَنْ cognomento designatus;

ap. gramm. *appellativum nomen.*

هَنْدَنَانٌ *v. s.* **هَنْدَنَانٌ**

هَنْبَلٌ, *pl.* **هَنْبَلَانٌ**, *et* **هَنْبَلَانٌ**, **هَنْبَلَانٌ** placenta.

كَلْبَهْمَانٌ, *pers.-ar.* **كَلْبَهْمَانٌ** vas figulinum in quo frumentum reconditur; horreum.

فَلْبَقٌ, *ar.* **خَنْدَقٌ**, *pers.* **فَلْبَقٌ**, fossa; vallum.

هَنْبَلَانٌ *placenta, i. q.* **هَنْبَلَانٌ**.

حـ - *Exstat in part. pass.*

pro adj. usurp. حـنـخـاـ، حـنـخـاـ
f. emph. حـنـخـاـ venerabilis ;
 gravis ; modestus, humilis ;
 probus, honestus, castus ; *cfr.*
heb. חـנـחـ humiliavit.

Ethpe. حـاـنـخـاـ cum gravitate
 egit; gloriatus est, ornatus est.

Pa. حـنـخـ venerandum reddidit ;
 ad honestatem revocavit, ad
 moderationem induxit ; exor-
 navit, laudibus extulit. *Part.*
pass. محـنـخـاـ ; محـنـخـاـ , مدـنـخـاـ
 admodum venerabilis, orna-
 tissimus.

Ethpa. حـاـنـخـاـ gloriatus est.

حـنـخـاـ graviter, modeste.

حـنـخـاـ gravitas, veneratio ;
 modestia ; moderatio animi.
 حـنـخـاـ مـنـخـاـ وـنـخـاـ habitus vene-
 rabilis.

حـدـنـخـa modestia, castitas.

حـنـخـاـ ornans ; ornator.

حـ, *heb.* ; =, basis, fundamen-
 tum ; radix, stirps, truncus ;
 caulis.

Pa. قـنـقـ v. *denom.*, caulem pro-
 duxit.

حـنـخـاـ, *pl.* قـنـقـ *id. q.* حـنـخـاـ ; *it.* sporta.

حـنـخـاـ, nomen duorum mensium,
scil. 1 حـنـخـ vel حـنـخـ مـبـحـاـ Decem-

قُنْمَهْ فِيْهَا citharista.

حَدَّفَ , heb. כָּנֵס , ar. كَنَسْ , collegit, se collegit ; congregatus est, convenit ; condensatus est ; verrit. حَدَّفَ مَذْتَهْ hydropicus fuit. حَدَّفَ اْنِيْمَهْ animum ad se revocavit. حَدَّفَ مَهْمَهْ vel گَنْهَهْ حَدَّفَ قَنْهَهْ fasciis involvit corpus mortui ; c. vel s. لَهْ ad se collegit Deus justum mortuum. Part. pass. حَنْمَهْ , حَانَهْ ; حَنْمَهْ مَتَهْ hydropicus. لَهْ وَهَنْهْ mens recollecta.

Ethpe. اَدَنْهَهْ passiv. et refl. ; mortuus est. اَدَنْهَهْ حَمَّهْ sepultus est; ap. gramm. pluraliter formatus est. حَدَّهْ حَنْهْ , colligitur, consequitur quod. Pa. قَنْهْ congregavit, congregavit ; conjunxit, collegit ; hospitio exceptit ; revocavit ; ratiocinando conclusit ; ap. gram. plurale formavit. قَنْهْ ۖ وَنْهْ cohibe animum tuum a ; حَنْهَهْ نَهْمَهْ nosmetipsos colligamus orando.

Ethpe. اَدَنْهَهْ pass. et refl. ; conjunctus est, convenit ; devastatus est. اَدَنْهَهْ حَلْوَهْ in hoc consentiunt. Part. pass. قَنْهْ مَهْ , حَنْهَهْ ; impers. sequitur.

قُنْمَهْ , قُنْمَهْ congregatio ; cœtus, conventus ; turma, multitudo ; ap. gramm. plurale ; adverb.

قُنْمَهْ قُنْمَهْ gregatim, catervatim ; حَدَّهْ in communi, simul.

قُنْمَهْ ad cœtum spectans.

قُنْمَهْ collectio, congregatio ; actio verrendi. حَدَّهْ مَتَهْ hydropisis.

حَاهْهَهْ id. q. ; spec. conventus ad saera ; concilium, synodus ; coenobium. حَهْهَهْ حَاهْهَهْ conventicula.

حَاهْهَهْ collector.

حَاهْهَهْ congregatio.

حَاهْهَهْ collectivus.

حَاهْهَهْ , pl. دَنْهَهْ , دَنْهَهْ et دَنْهَهْ congregatio, cœtus, ecclesia ; spec. synagoga, c. suff. دَنْهَهْهَهْ , cœtus eorum. دَنْهَهْهَهْ دَنْهَهْ synagoga. حَاهْهَهْهَهْ congregatim ; communiter, universim ; pluraliter.

حَاهْهَهْ congregatio, collectio, conjunctio, summa ; trop. recollectio mentis ; plurale ; حَاهْهَهْ conjunctim.

حَاهْهَهْهَهْ actus colligendi, congregandi ; collectio ; res collectæ, collectio operum auctoris, epitome, summa ; illatio. حَاهْهَهْهَهْ sordes collectæ verrendo ; glomus gossypii.

مَحْتَمِلُهُ, *f. emph.*

congregator, collector; compilator; *mortui* sepultor; gramm. collectivum *nomen*; illationis *particula*.

مَحْتَمِلُهُ et مَحْتَمِلُهُ, *it.* **مَحْتَمِلُهُ et مَحْتَمِلُهُ**, *ar.* **مَحْتَمِلُهُ**, *pl.*

et مَحْتَمِلُهُ scopæ: verriculum; *trop.* meteorum *simile scopis*.

مَحْتَمِلُهُ congregabilis.

مَحْتَمِلُهُ congregatio; coniunctio.

مَحْتَمِلُهُ id. q. **مَحْتَمِلُهُ v. s.** **مَحْتَمِلُهُ**.

مَحْتَمِلُهُ v. s. .

حَصَّل, *fut.* **نَحْمَلُ** operuit, contextit; *cfr. heb.* חַסֵּל *et ar.* **كَسَّ** induit, texit. *Part. pass.* **حَصَّا**, **حَصَّا**; *adj.* latens, secretus, mysticus; *f. emph.* **حَصَّا**, *pl.* **حَصَّتَهُ**, **حَصَّتَهُ** secreta, ænigmata; mysteria.

Pa. حَصَّدَ texit, induit, cooperavit; obturavit, obruit, abscondit, *c. acc. vel حَصَّا*, *vel حَصَّا*; **حَصَّ تَوْفِيَةً** se dissimulavit. *Part. act.* **حَصَّدَ** latens; *trop.* **حَصَّدَكَهُ** **حَصَّدَكَهُ** tegens culpamejus: condonans. *Part. pass.* **حَصَّدَ**, **حَصَّدَ**; latens; **حَصَّدَ** **حَصَّدَ** tiaris induti.

Ethpa. **أَحَصَّ** *pass. et refl.*; **حَصَّا** **حَصَّهُ** induant se cili-

ciis; *trop.* superatus est.

فَحْسُ absconsio; *c. o.* secreto, clam.

فَحْسُ obtectio; opereulum, tecatum, tegumentum.

فَحْسُ, *pl.* **فَحْسُ** cucullus; pileus, pileolus.

فَحْسُ in abscondito; secreto, mystice.

فَحْسُ absconsio; status absconditus *rei*, secretum.

فَحْسُ absconsio; indumentum.

فَحْسُ secretus.

فَحْسُ secreto.

فَحْسُ operiendus.

فَحْسُ, *pl.* **فَحْسُ**, **أَحَصَّ** tegumentum, indumentum, vestis; velamen.

فَحْسُ, *et* **فَحْسُ**, tempus quo luna plena est, plenilunium, dimidium mensis.; *it.* tempus quo luna sensim obtegitur.

حَصَّانِيَّات **خَيْرِيَّات**, munera honoraria.

حَصَّانِيَّات **خَانْثِيَّات**, xanthium planta (gall. lampourde).

حَصَّهُؤْمَيَّات *et* **حَصَّهُؤْمَيَّات** **خَيْرِيَّات**, xyris planta (gall. glaïeul)

حَصَّهُؤْمَيَّات *et* **حَصَّهُؤْمَيَّات**, *v. s.* **حَصَّهُؤْمَيَّات** *et* **حَصَّهُؤْمَيَّات**.

حَصَّهُؤْمَيَّات, *fut.* **نَحْفَقَهُ** amputavit, præcidit. **حَصَّهُؤْمَيَّات** vi-

- tem putavit.
- Ethpe.* حَسَنٌ pass.
- Pa.* حَسَنٌ *id. q. Pe.*
- حَسَنٌ putatio arborum, vineæ.
- حَسَنٌ cepula, bulbæ.
- حَسَنٌ et حَسَنٌ putator.
- حَسَنٌ falcula vinitoria (*gall.* serpette).
- حَسَنٌ interscapulum ; *it. ut.* حَسَنٌ *v. infra.*
- حَسَنٌ cartilago ; medulla ; pars ossium edibilis.
- حَسَنٌ et حَسَنٌ *ξύστρον*, radula (*gall.* ratis-soir) ; *it.* *ξυστός*, porticus ; atrium.
- حَسَنٌ et حَسَنٌ hederæ species.
- حَسَنٌ *ξύριον*, novacula.
- حَسَنٌ *ξέστης*, sextarius, mensura liquidorum.
- حَسَنٌ et حَسَنٌ, *ξύριον*, xyphium planta, gladiolus (*gall.* glaïeul).
- حَسَنٌ et حَسَنٌ cophinus; modulus ad formandos lateres.
- حَسَنٌ gypsum.
- حَسَنٌ *pl. مَكْلُومَة* cucurbitula (*gall.* ventouse) ; inter-scapulum.
- حَسَنٌ *ars cucurbitulas applicandi.*
- حَسَنٌ, *pl. مَكْتَبَة* crustula, placentulæ ; fruges aridi.
- حَسَنٌ, *pl. مَكْتَبَة* coralium.
- حَسَنٌ *مَكْلُومَة* cannabis.
- حَسَنٌ *frustulum panis.*
- حَسَنٌ et حَسَنٌ *ξένος*, hospes, peregrinus.
- حَسَنٌ *ξένιος*, hospitum cura-tor.
- حَسَنٌ *verb. den.*, peregrinus fuit.
- حَسَنٌ *hospitio exceptus est.*
- حَسَنٌ *peregrinatio.*
- حَسَنٌ *et حَسَنٌ ξενοδοχεῖον*, hospitium.
- حَسَنٌ *ξάνθιον*, xanthium planta (*gall.* lampourde).
- حَسَنٌ, *fut. تَحْسِنَ* et *تَحْسِنَ* com-minuit, reprehendit. *Part. pass.* حَسَنٌ, *تَحْسِنَ* contritus, confractus.
- Ethpe.* حَسَنٌ *reprehensus est*, redargutus est.
- Pa.* حَسَنٌ *ut Aph.*
- Aph.* حَسَنٌ *reprehendit*, redar-guit. *Part. act.* حَسَنٌ, حَسَنٌ.
- Ettaph.* حَسَنٌ *pass.*
- حَسَنٌ *reprehensio*, *pl. مَكْتَبَة*, soleæ, sandalia ; lumbi.
- حَسَنٌ, *pl. مَكْتَبَة* et حَسَنٌ *lumbi* ; ima pars dorsi.
- حَسَنٌ, *pl. مَكْتَبَة* et حَسَنٌ *fœnum* ;

cfr. قَتْ et neo-ar. قَشْ .
مَحْمِنْ, correptor, redar-
 gutor ; correptorius, *f. emph.*
مَحْمِنْمَا.
مَحْمِنْيَةً reprehensive.
مَحْمِنْمَا, *nng.* **مَحْمِنْمَاتِمَا**, *pl.*
مَحْمِنْيَا correptio; admonitio;
 argumentum ; criminatio.
مَحْمِنْمَا reprehendens.

مَهْفُ *cfr. assyr. kaspu,*
heb. כַּפֵּ, et ar. كَنْ, argen-
 tum, pecunia ; quæstus ; *pl.*
مَهْفُ **وَمَهْفُ** nummi. **مَهْفُ** **وَمَهْفُ** capi-
 tatio, census. **أَلْهَفَ** **وَمَهْفُ** mille argentei ; *c. suff.*
 argentum meum, **مَهْفُ** ar-
 gentum eorum.
مَهْمَفَا aroma ex variis elemen-
 tis compositum.

أَمْهَنْ *et deriv. , v. s. / أَمْهَنْ*.
مَهْمَهْ olitor ; mercator edulio-
 rum.
مَهْمَنْ ærumna, angustiæ ; *cfr.*
ar. كَسَرْ fregit.
مَهْمَنْ defatigatus.
مَهْمَنْ catinus.
مَهْمَنْ *et* **مَهْمَنْ**, *it.* **مَهْمَنْ** *et*
مَهْمَنْ *تَرْمِيدِيَّ*, medicamen-
 tum siccum ; *it. elixir, ar.*
الْأَخْيَرِ.

مَهْنَمْ, placenta ; *cfr. مَهْنَمْ*, *ar.*
كَنْكَ *et pers. كَانْكَ*.
مَهْنَمْ, *fut.* تَهْنَمَ, inclinavit ;
 effudit ; evertit, subvertit ;
 se incurvavit, *c. حَلَّ* ; **مَهْنَمْ** **أَقْتَيَّ** procidit in faciem
 suam. **مَهْنَمْ** **لَمَهْنَمْ** beneficium
 negavit ; *cfr. مَهْنَمْ et* *ar. سَفَرْ*, *et*
pass. كَفَّا vas effudit. Part.
مَهْنَمْ وَمَهْنَمْ ; **مَهْنَمْ**, **مَهْنَمْ** حَمَّةٌ se prosternunt An-
 geli coram Deo.
Ethpe. أَدْهَنْ *pass. et refl.*
Eschtaph. أَعْدَنْ obrutus est.
مَهْنَمْ occultatio.
مَهْنَمْ, *fut.* تَهْنَمَ esurivit ;
trop. appetitiv.
Ethpe. أَدْهَنْ *ut Pe.*
Ethpa. أَدْهَنْ famelicus fuit ;
 esurivit.
Aph. أَدْهَنْ ad famem redegit.
مَهْنَمْ **مَهْنَمْ** esuries, fames ;
مَهْنَمْ **مَهْنَمْ** atrox fames, phage-
 dæna ; *adject. sed tunc nng.*
مَهْنَمْ, *f. emph.* **مَهْنَمْ** fameli-
 cus, esuriens ; *trop.* appetens.
مَهْنَمْ **مَهْنَمْ** esurientes sumus.
مَهْنَمْ **مَهْنَمْ** ex fame.
مَهْنَمْ **مَهْنَمْ** fames.
مَهْنَمْ, *fut.* تَهْنَمَ contraxit,

abbreviavit; *cfr.* γέρ con-
traxit, occlusit.

دَفَّهَةً abbreviatio.

دَفَّهُمْ immundus, foedus.

دَفَّهُمْ menstruum, menstrua
muliebria.

دَفَّهَهُمْ, *f.* **دَفَّهَهُمْ** et **دَفَّهَهُمْ** menstrualis; menstrua pa-
tiens. **دَفَّهَهُمْ وَمَا دَفَّهَهُمْ** sanguis mens-
truus.

دَفَّ, *fut.* **دَفَّهُ**, imper.

دَفَّهَ curvavit, flexit. **دَفَّ**

دَفَّهَهُ genuflexit. *Part.*
act. **دَفَّا**; **دَفَّا**; **دَفَّا** *contr.*

دَفَّا curvo. *Part.* **دَفَّا** *curvo.* *Part.*

pass. **دَفَّهُ**, **دَفَّهُ**; *adj.* gib-
bus, arcuatus; aduncus.

دَفَّهُ **دَفَّهُ** linea curva.

دَفَّهُ **سَنْ**; **دَفَّهُ** nasus aquilinus;

cfr. **دَفَّ** *et* **دَفَّ**.

Ethpe. **دَفَّهَ** *pass.* *et refl.*

Pa. **دَفَّهَ** curvavit, inflexit.

Ethpa. **دَفَّهَ** *pass.* *et refl.*; *it.*

lapis factus est, *denom.* **دَفَّا**.

دَفَّهَ *Pa. verb.* **دَفَّهَ**.

دَفَّهَ *f.*, *et* **دَفَّهَ**, *pl.* **دَفَّتِ**,

heb. **دَفَّهَ** *et ar.* **دَفَّتِ**, vola manus,

palma; *metaph.* manipulus,

pugillus; *it.* *et spec.*

دَفَّهَ, *ar.* **دَفَّهَ** *et* **دَفَّهَ**,

vasculum, acerra cava; lanx

libræ; fornix; capsæ; sella,
pilentum.

دَفَّهُ haustum.

دَفَّهَةً curvatura, incurvatio.

دَفَّهَاتِ, *pl.* **دَفَّهَاتِ** incurvatio; curvatura, dorsum, sphæra;
segmentum circuli.

دَفَّهَةً incurvatio; curvatura.

دَفَّهَاتِ, *pl.* **دَفَّهَاتِ** patena, dís-
cus; capsæ, sacra pyxis; capsæ incensi; *nnq.* *absol.*
capsæ librorum; thuribulum.

دَفَّهَةً *dim.*, capsula.

دَفَّهَةً fornix, cæli curvatura;
arcus; *cfr.* **دَفَّ**.

دَفَّهَةً, *v. s.* **دَفَّهَةً**.

دَفَّهَةً in modum fornicis in-
curvatus.

دَفَّهَ, *fut.* **دَفَّهَهُ** detersit,
purgavit; negavit, abnegavit,
deseruit, abrenuntiavit, pler.

c. **دَفَّهَ**, *nnq. c.* **دَفَّهَ** *reī*; apostata fuit. *Part. act.* **دَفَّهَ**; **دَفَّهَ**;

دَفَّهَهُ negans gratiam:
ingratus. *Part. pass.* **دَفَّهَ**, **دَفَّهَهُ**,

abrenuntiatus; male-
dictus; *act.* negans, incredu-
lus; *impers.* **دَفَّهَ** te ab-
renuntio.

Ethpe. **دَفَّهَهُ** *pass.*

Pa. **دَفَّهَ** abstersit, extersit;
delevit; *it. ut Aph.*

Ethpa. دَفَعَ لِ pass. ; it. evanuit.

Aph. حَفَّ apostamat fecit; abrenuntiare fecit, abnegare fecit. حَفَّةً negatio ; infidelitas. apostasia.

حَفَّهُمْ negans ; infidelis, apostata, ingratus ; gramm. negativus.

حَفَّهُمْ impie ; negatorie.

حَفَّهُمْ negatio, infidelitas ; impietas, abrenuntiatio ; ingratus animus.

حَفَّهُمْ infidelitas.

حَفَّهُمْ , ar. حَفَرْ , pix, bitumen ; purgatio ; linteum abstergens ; res abstersa, sordes, purgamentum, peripsema.

حَفَّهُمْ , ar. حَفَرْ , pix, bitumen ; cypruss, κύπρος ; it. stercus, κύπρος .

حَفَّهُمْ bituminosus, f. حَفَّهُمْ , lac Asphaltitum.

حَفَّهُمْ , assyr. Kupru, heb. כְּפָרָה , ar. قَنْر , vicus.

حَفَّهُمْ dimin., viculus ; pl. حَفَّهُمْ , pagi rustici, suburbium.

حَفَّهُمْ amphora.

حَفَّهُمْ abstergens ; apostatare faciens.

حَفَّهُمْ bellaria.

حَفَّهُمْ et حَفَّهُمْ helleborus.

حَفَّهُ , fut. حَفَّهُ protulit folia, fructus, produxit grana ; intr. efformatus est fructus.

Ethpe. حَفَّهُ efformatus est fructus in nodos.

Pa. حَفَّهُ nexuit.

حَفَّهُمْ formatio fructus, calix flororum ; cfr. حَفَّهُ .

حَفَّهُمْ flos, calix floris.

حَفَّهُ adv. loci, ubi. حَفَّهُ ubi ; præc. حَفَّهُ , quo, illuc. حَفَّهُ ubicumque ; præc. حَفَّهُ , quocumque ; حَفَّهُ بَيْنَ حَفَّهُ versus ; حَفَّهُ مِنْ حَفَّهُ unde. حَفَّهُ مِنْ حَفَّهُ unde cumque.

حَفَّهُ , fut. حَفَّهُ brevis fuit ; moestus fuit, doluit ; pler. impers. : حَفَّهُمْ doluit de. حَفَّهُمْ وَلَدَهُمْ nos mœrere æquuum est. Part. præs. حَفَّهُمْ ; it. impers. حَفَّهُمْ , dolet. حَفَّهُمْ لِ الْمُحْسَنِ مِنْ حَفَّهُ de dormientibus nolite contristari. Part. pass. حَفَّهُمْ ; حَفَّهُمْ doluit ; pro adj. usurp. , pl. حَفَّهُ , emph. حَفَّهُ , f. emph. حَفَّهُ , pl. حَفَّهُ , حَفَّهُ , brevis, minor ; brevior, pler. seq. حَفَّهُ ; trop. حَفَّهُمْ حَفَّهُ brevis spiritu : im-

patiens; *gram.* brevis *vocalis*, syllaba; *adverb.* حـمـمـاـهـ breviter.

Ethpe. اـهـمـاـهـ abbreviatus est.

Pa. فـمـاـهـ abbreviavit, contraxit. *Part. pass.* حـمـمـاـهـ destitutus.

Ethpa. اـهـمـاـهـ pass.; *trop.* contristatus est.

Aph. فـمـاـهـ abbreviavit, contraxit; *c.* فـمـاـهـ cohibuit; contrastavit, *c.* حـلـاـهـ pers.; *it.* doluit, *Part. pass.* حـمـمـاـهـ, *pl.* حـمـمـاـهـ, *nng.* مـاـهـمـاـهـ.

حـمـمـاـهـ *m.*, *pl.* حـمـمـاـهـ et حـمـمـاـهـ, *ar.* كـرـيـهـ, cumulus, *spec.* tritici; horreum. حـمـمـاـهـ cumulatim.

حـمـمـاـهـ *vel* id.

حـمـمـاـهـ *et* حـمـمـاـهـ *v. s.* .

حـمـمـاـهـ, *pl.* حـمـمـاـهـ pollex manus *vel* pedis.

حـمـمـاـهـ breviter.

حـمـمـاـهـ brevitas, contracatio; حـمـمـاـهـ exiguitas temporis; *trop.* angustia, tristitia, dolor; حـمـمـاـهـ spiritus difficultas: angustiae; *adverb.* حـمـمـاـهـ وـهـمـاـهـ reluctantanter.

حـمـمـاـهـ jugum textorium; *cfr.* حـمـمـاـهـ et حـمـمـاـهـ abbreviatio.

حـمـمـاـهـ contractio.

حـمـمـاـهـ angustia, dolor.

χαραδρίος, pluvialis avis (gall. pluvier).

حـمـمـاـهـ, *fut.* حـمـمـاـهـ aravit; novavit agrum; *trop.* meditatus est.

Ethpe. حـمـمـاـهـ aratus est.

حـمـمـاـهـ aratio; sulcus; ager, ager novalis.

حـمـمـاـهـ rusticus.

حـمـمـاـهـ arator.

حـمـمـاـهـ arator; aratrum; jugum textorum; *pl. f.* حـمـمـاـهـ cultrices.

حـمـمـاـهـ aratio.

كـرـبـهـ et حـمـمـاـهـ حـمـمـاـهـ, xράμβη, ar. crambe, brassica.

حـمـمـاـهـ, *heb.* כְּרוֹב, *pl.* حـمـمـاـهـ حـمـمـاـهـ Cherub.

حـمـمـاـهـ cherubicus.

حـمـمـاـهـ psyllum planta (gall. plantain).

حـمـمـاـهـ crista.

حـمـمـاـهـ, *pers.* حـزـنـهـ, custos jumentorum; equarius (gall. palefrenier).

حـمـمـاـهـ carbasus, byssarius, *al.* proxeneta (gall. courtier).

حـمـمـاـهـ, *ar.* حـرـجـهـ, pera, hippopera.

حـمـمـاـهـ morbus, ægritudo.

አ, fut. ዓገሮች ægrotavit.
cfr. ተ. Part. pass. pro adj. usurp. ማስታወሻ, ተመሳሳይ f. emph. አጠቃላይ ægrotus, infirmus, debilis, morbidus; trop. ማስታወሻ heterodoxus; ap. gram. አጠቃላይ መተዳደሪያ litteræ infirmæ seu semivocales l, o et u; ተመሳሳይ nosocomium.

Ethpe. ዓገሮች ægrotavit, languit; trop. doluit.

Pa. ዓገሮች ægrotare fecit; infirmum reddidit. Part. pass. ዓገሮች ægrotus.

Ethpa. ዓገሮች ውቃጥት ægrotavit; morbum simulavit.

Aph. ዓገሮች ut *Pa.*; seq. ዓገሮች se ægrotum esse simulavit.

Part. pass. ዓገሮች, ዓገሮች ægrotus.

አጠቃላይ, ዓገሮች morbus, languor; trop. malum.

አጠቃላይ morbidus.

አጠቃላይ ægritudo, languor; debilitas.

አጠቃላይ et **አጠቃላይ** morbum produceens; pudor.

አጠቃላይ cuminus, carvi planta; cfr. ar. كَرْزِيَّة.

አጠቃላይ, **አጠቃላይ** ዘመኑ, vide. s. አጠቃላይ.

አጠቃላይ ጥምኩን ገዢኝነς, tempus.

አጠቃላይ ገዢኝነቶች, chronographia, temporum descriptio.

አጠቃላይ et **አጠቃላይ**, pl. ዓገሮች ገዢኝነት, ገዢኝነቶች, τάχ χρονικά, chronica, annales; calendarium.

አጠቃላይ scriptor chronicorum.

አጠቃላይ ገዢኝነት ገዢኝነት, aurum.

አጠቃላይ ገዢኝነቶች ገዢኝነቶች, chrysogonon planta.

አጠቃላይ ገዢኝነቶች ገዢኝነቶች, chrysocome herba (gall. serpolet).

አ, cfr. አጥብርዎ, ar. كَرْز, prædicavit.

Ethpe. ዓገሮች prædicatus est, promulgatus est; proclamatus est; præco factus est.

Aph. ዓገሮች voce præconis annuntiavit, prædicavit; publice doceuit, annuntiavit; proclamavit; præcinit. Part. pass.

አጠቃላይ prædicatus; voce præconis expulsus; in exilium missus; exheredatus; infamis.

አጠቃላይ, **አጠቃላይ** præco; prædictor; አጥቢር; concha margaritifera.

አጠቃላይ, pl. **አጠቃላይ** præco-

nium ; prædicatio, proclama-
tio ; *per extens.* concio, Evan-
gelium.

كَرْزٌ et دَهْوَانٌ , ar. pera
viatoris.

كَرْزٌ , ar. - pers. cantharus.
كَرْازٌ , ar. hircus vel aries
pecoris dux, qui peram pasto-
ris portat.

كَرْزٌ præco, prædicator.

الْمَحَاجَةُ prædicatio.

الْمَوْلَى et دَهْمَلٌ pastor ovium ;
pedum pastorale ; cfr. pers.
كَرْزٌ clava.

الْمَوْلَى et فَتَّا bellator ; cfr.
دَهْمَلٌ et pers. گارزار prælium.

كَرْزٌ , ar. دَهْفُسٌ , tugurium ; cel-
lula eremite ; monachus.

كَرْزٌ cellæ habitator, ana-
choreta ; monachus.

كَرْزٌ c., pl. دَهْمَلٌ γράπτης , ar.
قَرْطَافٌ , charta ; syrapha,
libellus.

كَرْزٌ chartularius.

كَرْزٌ id. q. فَتَّا , et deriv.
كَرْزٌ , v. s. فَتَّا .

كَرْزٌ γρισός , Christus.

كَرْزٌ et لَهْجَانٌ christianus, f.
كَرْزٌ .

كَرْزٌ , f. دَهْمَلٌ id.

كَرْزٌ دَهْمَلٌ more christiano-
rum, ut christianum decet.

دَهْمَلٌ et دَهْمَلٌ chris-
tiana religio.

جُودَهْلُونْدٌ Judæo-christia-
nus.

Ethpalp. دَهْلَانٌ et دَهْلَانٌ
christianus factus est.

دَهْمَلٌ , دَهْمَلٌ et دَهْمَلٌ ,
f. γρηγορίου , pl. دَهْمَلٌ usus ;
testimonia auctorum, chria ;
ap. gram. paradigmata.

دَهْمَلٌ γρίσυα , unguen-
tum.

دَهْمَلٌ , fut. دَهْمَلٌ et دَهْمَلٌ circum-
vivit, perlustravit, c. دَهْمَلٌ
vel دَهْمَلٌ loci ; trop. invigilavit,
visitavit successive, c. دَهْمَلٌ
pers. circumdedit, einxit, ob-
sedit ; texit, involvit, convol-
vit ; circumtotondit. Part.
act. دَهْمَلٌ ; adverb.
دَهْمَلٌ دَهْمَلٌ circumcirea. Part.
pass. دَهْمَلٌ , دَهْمَلٌ ; it. active
circumdans, cfr. ar. دَهْمَلٌ .

Ethpe. دَهْلَانٌ pass. ; it. ut Pe. ;
moratus est. c. aff. دَهْمَلٌ كَهْمَلٌ
دَهْمَلٌ vel s. aff. دَهْمَلٌ كَهْمَلٌ
دَهْمَلٌ circuite urbem.

Pa. دَهْمَلٌ circumduxit ; convol-
vit.

Ethpa. دَهْلَانٌ pass. ; it. circum-
vivit, obsedit, cum دَهْمَلٌ .

Aph. دَهْمَلٌ circumire fecit,

circumduxit; involvit; مَحْمَدٌ دَعَ
versantes has litteras in ore, i. e.
pronuntiantes.

الْمَدْهُونَ revolutio, circuitus;
circulus; convolutio.

الْجُرْجُورَةُ crocus.

فَجْرًا, pers. - ar. كُنْكَدْنُ, rhinoceros.

နှင့် negligenter scripsit.

خَرْجِيٌّ *xerjīs*, *xerjīdā*, pecten
textorius; radius brachii.

crocus sativus.

Palp. **خُفَّ** *v. denom.*, croceum reddidit.

Ethpalp. ظافـفـه obscurus,
nigrescens factus est.

الْأَوْدُورِيَّةُ color

دُهْ وَ قُمْدَنْ croceus
قُمْلَى cingulum

Ἄγκος ἄγκος; baculus capite
adunco: *cfr.* οὐρών.

جَنْبُونٌ curvatus, curvus.

وَمُهُونٌ curvate.

מִקְרָא, fut. **מִקְרָא** amputavit.

Part. act. **فَتْح**; subst. **فَتْحًا**

vinito. Part. pass. ~~Ex-.~~
abscissus; it. adj. deriv. a

Loxo pudicus, modestus
(gall. retenu); subst. ille cui

Etlia cinti nasi

فَنْ مُهْمَّا vinea, vitis, ar. كَرْمٌ ;

it. paradisus ; abacus.

فَنْ مُهْمَّا ad vitem pertinens.

فَنْ مُهْمَّا et فَنْ مُهْمَّا amputatio, resec-

tio.

فَنْ مُهْمَّا vinitor.

فَنْ مُهْمَّا, pl. فَنْ مُهْمَّا epistylium ; abacus.

فَنْ مُهْمَّا, فَنْ مُهْمَّا χρύσης, color, fucus; color vultus, et per ext. vultus ipse ; trop. pudor, prætextus ; بِلْلَه فَنْ مُهْمَّا impudens.

فَنْ مُهْمَّا, f. emph. فَنْ مُهْمَّا versicolor, impudens.

فَنْ مُهْمَّا impudenter.

فَنْ مُهْمَّا audacia ; impudentia.

فَنْ مُهْمَّا sorbus domestica.

فَنْ مُهْمَّا musa arbor et fructus.

فَنْ مُهْمَّا χρόνος, tempus, et deriv. v. s. فَنْ .

فَنْ مُهْمَّا, usit. in imper. فَنْ مُهْمَّا absiste a me.

فَنْ مُهْمَّا f., pl. فَنْ مُهْمَّا, ar.

بَرْيَشْ, venter, ventriculus; uterus ; fructus ventris, foetus ; trop. fames, appetitus, gula.

فَنْ مُهْمَّا c., ar. fasciculus, libellus, liber. فَنْ مُهْمَّا بَقْتَهْلَه catalogus nominum.

فَنْ مُهْمَّا id. ; pera.

فَنْ مُهْمَّا ventricosus.

فَنْ مُهْمَّا m., st. c. فَنْ مُهْمَّا, pl.

فَنْ مُهْمَّا, فَنْ مُهْمَّا sedes, solium, sella ; basis columnæ etc. ; c. off. فَنْ مُهْمَّا, فَنْ مُهْمَّا sedes mea, sua.

فَنْ مُهْمَّا fasciculus stipularum.

فَنْ مُهْمَّا χρυσόπραξος, chrysoprasus gemma.

فَنْ مُهْمَّا χρυσόλιθος, chrysolithus gemma.

فَنْ مُهْمَّا, ar. كَرْسِوَة, id. q. فَنْ مُهْمَّا q. videoas.

כְּרִיעָה, فَنْ مُهْمَّا f., heb. et ar. קַרְעָא, crus et per ext. sinus maris ; it. al. فَنْ مُهْمَّا lac primum post partum ; lac coagulatum.

فَنْ مُهْمَّا, pl. فَنْ مُهْمَّا femur.

فَنْ مُهْمَّا vel فَنْ مُهْمَّا vipera, aspis.

فَنْ مُهْمَّا, pl. فَنْ مُهْمَّا supellex, ustensilia ; فَنْ مُهْمَّا بَوْمَتَا species falsa aquarum in deserto (gall. mirage).

كَرْفَس, فَنْ مُهْمَّا vel فَنْ مُهْمَّا, ar. apium planta (gall. ache).

فَنْ مُهْمَّا petroselinum.

فَنْ مُهْمَّا nasturtium.

فَنْ مُهْمَّا vox ar. خُرْص, inaures.

فَنْ - Inus. cfr. ar. كَار in spiram volvit.

omnia pulmenta simul promiscue reconduntur; trop. miscellanea.

﴿ حَمْفَرٌ ﴾ ; cfr. heb. حَمْفَرٌ , et ar. حَمْفَرٌ segnis fuit. Part. pass. حَمْفَرٌ ; adj. offensus, iratus, c. حَمْفَرٌ .

Ethpe. حَمْفَرٌ offensus est, scandalizatus est ; suspicatus est ; c. حَمْفَرٌ iratus est in *aliquem*.

Aph. حَمْفَرٌ offendere fecit, scandalizavit; offendit.

حَمْفَلٌ , قُمْلٌ offendiculum, scandalum ; scrupulus.

حَمْفَلٌ et حَمْفَلٌ offendiculum, scandalum. حَمْفَلٌ ; حَمْفَلٌ scandalum dedit.

حَمْكَنَا offensio.

حَمْكَنَا scandalum patiens.

حَمْهَدٌ ramus sesami.

حَمْهَدٌ ervum *planta*, vicia.

﴿ حَمْهَدٌ - ﴾ cfr. heb. حَمْهَدٌ susurravit incantamenta.

Ethpa. حَمْكَنٌ rogavit, supplicavit, pler. c. حَمْكَنٌ . حَمْكَنٌ et suppliciter oravit ut acceptae essent oblationes suæ.

حَمْفَرٌ , حَمْفَرٌ supplicatio, deprecatio.

حَمْخَدٌ , f. حَمْخَدٌ , pl. حَمْخَدٌ stragulum.

حَمْخَدٌ , f. emph. حَمْخَدٌ deprecator, supplex ; gramm. precativus.

حَمْخَدٌ suppliciter.

حَمْخَدٌ supplicatio ;

حَمْخَدٌ , st. c. حَمْخَدٌ , pl. حَمْخَدٌ supplicatio, preces ; hymni ; c. aff. حَمْخَدٌ deprecatio mea.

حَمْخَدٌ deprecatus.

حَمْخَدٌ propitiabilis.

حَمْخَدٌ deprecabilis, propitiabilis.

حَمْخَدٌ supplicanter.

﴾

حَمْهَنٌ , fut. حَمْهَنٌ prospere se habuit ; profuit. Part. præs.

حَمْهَنٌ ; adj. utilis. حَمْهَنٌ inutilis; subst. حَمْهَنٌ doctor.

Pa. حَمْهَنٌ prospere egit.

Ethpa. حَمْكَنٌ profecit ; diligenter se gessit, studuit. حَمْهَنٌ diligenter divitias colligamus.

Aph. حَمْهَنٌ ut *Pa.* et *Ethpa.* ; it. emendavit.

حَمْهَنٌ prosperitas.

حَمْهَنٌ et حَمْهَنٌ trabs, pons; ratis ; cfr. حَمْهَنٌ , et ar.

جِنْزٌ .

حَمْهَنٌ , حَمْهَنٌ diligens, solers,

strenuus ; fortunatus; utilis.
مَنْ لَوْلَقْتُمْ أَكْمَنْ أَكْمَنْ quid mihi
profuit ?

أَكْمَنْ أَكْمَنْ strenue, diligenter ;
prospere.

أَكْمَنْ أَكْمَنْ strenuitas ; prosperitas,
felix status rei.

أَكْمَنْ أَكْمَنْ prosperitas, fortuna ;
diligentia, strenuitas ; opera
praestantia.

أَكْمَنْ أَكْمَنْ panicum milliaceum ;
spelta.

عَمَ - cfr. عَمَ et عَمَ collegit.
Aph. عَمَ abegit ; cfr. neo - ar.

أَكْمَنْ أَكْمَنْ id.; it. collegit;
أَكْمَنْ أَكْمَنْ eos in duos cumu-
los coacervarunt.

أَكْمَنْ أَكْمَنْ ، pl. مَحْمَنْ أَكْمَنْ flabel-
lum.

أَكْمَنْ أَكْمَنْ ، pl. مَحْمَنْ id.
أَكْمَنْ ، v. s. ۱۵۵ .

أَكْمَنْ fut. مَحْمَنْ scriptis, ex-
cripsit, rescripsit, impressit ;
adscripsit ; decretiv ; testa-
mento legavit ; litteris man-
davit, vocavit, seq. ةَكْمَنْ ; -
أَكْمَنْ أَكْمَنْ فِي كِتَابِهِ annu-
merasti eum inter fures.
أَكْمَنْ أَكْمَنْ quod ad illud atti-
net quod scripsisti... أَكْمَنْ de philosophia tracta-

vit. أَكْمَنْ مَعْدِي دَلْلَةِ num-
mos in suo nomine proculit.
أَكْمَنْ أَكْمَنْ ipsi tribu-
tum imposuit. Part. act. فَدَّ ،
فَدَّ ، f. emph. أَكْمَنْ pl. m.
فَدَّ ، f. فَدَّ ، st. c. فَدَّ ;
subst. scriptor , scriba.
فَدَّ دَلْلَةِ scribo. Part. pass.
فَدَّ ، f. emph. مَحْمَنْ ;
فَدَّ ، f. وَدَّ sicut scriptum est;
subst. sumptum, v. infra.

Ethpe. أَكْمَنْ pass ; consigna-
tus est ; militiae nomen dedit.

Pa. أَكْمَنْ scriptis, scribendum
curavit.

Aph. مَحْمَنْ ut Pe. ; præscripsit,
codicem transcribendum cu-
ravit, composuit librum, unde
part. act. مَحْمَنْ أَكْمَنْ chrono-
graphus. Part. pass. مَحْمَنْ ،
emph. مَحْمَنْ ; subst. vide in-
fra.

أَكْمَنْ ، مَحْمَنْ et مَحْمَنْ ، st. const.
أَكْمَنْ ، scriptum, mandatum ;
liber, tractatus ; historia ;
epistola : it. speciat. أَكْمَنْ ،
scriptio, scripture, inscriptio;
أَكْمَنْ أَكْمَنْ Biblia sacra.
أَكْمَنْ مَهْمَنْ theca librorum,
bibliotheca ; penula. أَكْمَنْ أَكْمَنْ
chirographum. أَكْمَنْ أَكْمَنْ
scriptio mea manu.
أَكْمَنْ dim., libellum.

مَحْدُودٌ ad scripturam pertinens; in libris usitatus, scripturalis; **مَحْدُودٌ لِّغَةً** lex scripta seu positiva. **مَحْدُودٌ فَهْدَهُ** effatum e Scriptura desumptum. **مَحْدُودٌ مَّعْدِلًا** stylus in scriptione usitatus; *subst.* bibliothecarius; bibliopola. **مَحْدُودٌ** scriptus, scripto notatus. **مَهْدَدٌ**, **مَهْدَهُ** scriba, notarius. **مَهْدَهُنَّ** dimin. *præc.*

مَهْدَهٌ scriptio, exscriptio; *ars scribæ.* **مَهْدَهٌ** f. **مَهْدَهٌ**, *st. c.* **مَهْدَهٌ**, *pl.* **مَهْدَهٌ**, scriptum, scriptio, inscriptio; epistola; scriptura, modus scribendi; Scriptura Sacra; litteræ Alphabeti; instrumentum, chirographum; litteris consignavit. **مَهْدَهٌ** litteris pictura in carne facta (*gall, tatouage.*)

مَهْدَهٌ exscriptus.

مَهْدَهٌ scripto.

مَهْدَهٌ scriptio.

مَهْدَهٌ, **مَهْدَهٌ** scriptio, descrip-
tio, graphium, stylus; subula
sutoris; **مَهْدَهٌ** chronolo-
gia.

مَهْدَهٌ scriptio, descriptio;
مَهْدَهٌ nominum cata-
logus.

مَهْدَهٌ scriptor; scriba, nota-
rius; **مَهْدَهٌ وَأَهْدَتْ** chrono-
graphus.

مَهْدَهٌ scriptio, descriptio,
recensio; scriptum, libellum;
historia scripta; pactum;
مَهْدَهٌ historia, chrono-
nicon. **مَهْدَهٌ** *لِّا* **مَهْدَهٌ** Geogra-
phia.

مَهْدَهٌ quod scribi potest;
scriptum.

مَهْدَهٌ scriptio, inscriptio.

مَهْدَهٌ, *pl.* **مَهْدَهٌ** cartilago;
pars ossis edulis.

مَهْدَهٌ, assyr. Kutallu, pars pos-
terior, *ar.* كُفَّلْ, puppis navis
vel gubernaculum ejus.

مَهْدَهٌ, *fut.* **مَهْدَهٌ**, macula-
vit, contaminavit, *cfr.* **مَهْدَهٌ**
niph. **مَهْدَهٌ**; *it.* impressit stigma,
colorem.

Pa. **مَهْدَهٌ** inquinavit. *Part. pass.*

مَهْدَهٌ, **مَهْدَهٌ**, f. *emph.*
مَهْدَهٌ; **مَهْدَهٌ** **مَهْدَهٌ** inconta-
minata; immaculata.

Ethpe. **مَهْدَهٌ** *pass.*

مَهْدَهٌ, **مَهْدَهٌ**, f. **مَهْدَهٌ**, *pl.*
مَهْدَهٌ macula; stigma,
cicatrix; lentigines; *trop.* tur-
pitudo, peccata.

مَهْدَهٌ maculosus.

مَهْدَهٌ contaminatio; macula.

מִדְבָּר מַנְטָן contaminans.

فَمَا exspectatio; mora, duratio.

لِتَّانٌ, *pl.* **لِتَّانٌ**, *ar.* كَتَانٌ *li-*
num; linteum.

لُوْجَادِن duratio, perseverantia.

Lysimachia lineus.

stable; **مَحْكُمٌ** stabilis; immobilis,
diturnus, tardus; **مَلِمْبُدٌ** res instabiles.

جَلَدٌ، مِنْجَلَدٍ، pl. جَمَادَاتٌ، et
جَلَدَاتٌ، pl. جَمَادَاتٍ،
γιτών, tunica; trop. tegu-
mentum, alba seu tunica sa-
cerdotalis; indusium; mem-
brana. لِكْنَةً وَجَلَدَاتٍ ar-
borum fibræ.

مَدْحُوقٌ مَّا starker.

دَرْجَةٌ وَنَهْدَىٰ duratio, permanentia,
pl. دَرْجَاتٍ وَنَهْدَىٰ .

هَدْفَعَ f., pl. هَدَافَعٌ et هَدْفَعَاتٌ, heb. כְּהַפֵּת et ar. كَفَّتْ, humerus, scapula ; fulcrum ; latus ; humeralia ; trop. onus, ministerium ; nissus ; c. suff. هَدْفَاعٌ humerus eorum. هَدْفَاعٌ هَدْفَاعٌ humeri. سِبَا هَدَافَعٌ junctim.

تَحْمِلُ, *fut.* تَحْمِلُ exagi-
tavit, tumultuavit; pugnavit
vehementer, contendit. *Part.*
تَحْمِلُ, *act.* تَحْمِلُ, تَحْمِلُ مَمْلُوكًا; تَحْمِلُ مَمْلُوكًا
quasi aerem verberans; *subst.*
bellator. *Part. pass.* تَحْمِلُ
تَحْمِلُ exagitatus; vexatus,
spec. a diabolo, inde obsessus,
hariolus, magus; contentio-
sus, furens; tumultuans, sæ-
viens.

فَرْدَان super humeros.
فَرْدَان vena a brachio pollicem usque decurrens.

Ethpe. اَنْهَىٰ pass. ; sæviit,
fremuit, conatus est. *Part.*
عَذَّبَهُ ، مُعَذَّبٌ oppugnatus ;
afflictatus ; *act.* sæviens, eni-
tens ; دَسَّلَهُ ، مَدَّهُ for-
titer dimicantes.

usque decurrentis
lýmphá humeralis

حَمَدٌ - *Pa.*; حَمَدَ mansit; ex-spectavit; perststit, moratus est; perseveravit; حَمَدَهُ وَهُنَّا intende in adjutorium meum. حَمَدَهُ وَهُنَّا in occupatione sedis episcopalnis remansit.

Ethpa. ;אֶלְיָהוּ mansit.

exagitatio, pugna.

exagitatio; perturbatione; pugna.

exagitatio, afflictio; plaga.

pugnans.

pugnator, athleta, defensor; vincibilis; gramm, nomen puncti seu accentus; pl. f. repugnantia inter se.

pugna, certamen; pretium certaminis, bravium. pugna

verborum, vana disputatio.

et pugna navalis.

— دَلْعَةٌ — فُلَاءٌ vel دَلْعَةٌ, m., gleba, lutum, massa luti;

cfr. ar. كَلْعَةٌ, rejectanea.

terra e qua educitur ferrum.

دَرْجٌ et دَرْجٌ cerealia sponte in agro et sine cultura nascentia; cfr. ar. كَاثٌ et كَاثٌ it. pers. كات id.

دَرْجٌ et دَرْجٌ id.



॥ seu حُمْدٌ duodecima littera alphabeti Syrorum. Una est ex particulis procliticis mnemotechnice vocatis: حَمْدٌ, quae inseparabiliter voci sequenti affiguntur: حَمْدًا regi, mihi, حَمْدٍ tibi, حَمْدًا nobis, حَمْدًا ipsis, etc. Numerice valet: 30; ॥ vel حَمْدٌ = 3000, حَمْدٌ = 30000 حَمْدٌ = trigesimus. Respondet heb. litteræ حَمْدٌ et ar. حَمْدٌ; nnq. c. al. liquidis præs. حَمْدٌ (حَمْدٌ, حَمْدٌ), et حَمْدٌ (حَمْدٌ, حَمْدٌ) permutatur: حَمْدٌ وَحْمَدٌ : idolum ; كَهْنَةٌ حَمْدٌ, nurus ; حَمْدٌ et سَفَّا, impius; حَمْدٌ طَمَس, delevit ; حَمْدٌ sa-phirus ; ॥ in pronunt. tacet seq. alio ॥: حَمْدٌ, حَمْدٌ ; it. in aliq. formis verbi ॥: حَمْدٌ, etc. Est particula directionis ad terminum, et inde nota est:

1° proprietatis, attributionis, et possessionis, respondetque dativo: حَمْدٌ لَّا حَمْدُ لَّا حَمْدٌ gloria Deo. قُمْ حَمْدٌ decrevit ei vestes i. e. dari ei vestes.

اًمِنْتَهَا حَمْدٌ مَّا كَيْدَهَا ancilla ei erat : habebat ancillam.

2° motus ad locum vel objectum, ad, in, versus; nnq., contra, spec. c. حَمْدٌ, ॥ et hujusmodi verbis; it. æquivalent partic. اَمِنْتَهَا vel على اَمِنْتَهَا ; على اَمِنْتَهَا ॥ vade in terram Israel; اَمِنْتَهَا حَمْدٌ مَّا اَمْنَتْهَا levavit ad eos tyrannus manum suam; ante infinitivum, cui semper præmittitur si ab al. verbo dependet, ad, ut, quam ut: حَمْدٌ اَمِنْتَهَا ad maledicendum eis. حَمْدٌ اَمِنْتَهَا حَمْدٌ فُرَاتٌ اَبَتْمَاءٌ ut lavarent in eis sacerdotes manus suas.

اَمِنْتَهَا حَمْدٌ اَمِنْتَهَا curari non potest. مَمْدُوسٌ حَمْدٌ auribus durior quam ut audiat; absolute حَمْدٌ اَمِنْتَهَا pro: اَمِنْتَهَا حَمْدٌ اَمِنْتَهَا mirari oportet, mirandum est. اَمِنْتَهَا حَمْدٌ اَمِنْتَهَا ad scrutandum. اَمِنْتَهَا وَلَامِنْتَهَا eum honorandi causa. وَكَمْ مَا كَيْدَهَا حَمْدٌ اَمِنْتَهَا وَلَامِنْتَهَا quid tibi opus est ut sollicitus sis de rebus alienis ?

3º regiminis, directi speciat.
determinati, c. verb. transitivo, inde ante nomina signum
est accusativi: ﻣَوْلَهُ «مَوْلَهُ»
id. q. مَوْلَهُ أَنْهُ occidit eos.
«مَوْلَهُ أَنْهُ دَعَاهُ اِلَيْهِ اِلَّا خَلَقَهُ» duxit uxorem
Jesabel. اِمْبَوْهُ كُو حَسَبْهُ مَوْلَهُ
اِلَّا خَلَقَهُ اِلَيْهِ ad te mittam unum
ex discipulis meis. فَهُمْ كَمَا حَسَبْهُمْ
اِلَّا خَلَقَهُ اِلَيْهِ segregate mihi Paulum et
Barnabam ad opus.

4º regiminis indirecti, respondet scilicet ablativo cum a vel ab: ۴۰ اَحْصِهُ مِنْ كَمْ مِنْ a ab eo edocti sunt. حَصَّهُ مِنْ كَمْ مِنْ a Joanne compositus. كَمْ مِنْ مَنْ a me dictus.

6º Ponitur pro variis aliis
præpos., uti: سُكْنَى، لَهْوٌ، لَهْوٌ مُّ
etc. مَدْحُوقًا fame periit.
لَهْوٌ مُّ frigore peribis.
﴿ مَدْنَةً ﴾ dixit de re, pro لَهْوٌ مُّ.
﴿ مَدْنَةً ﴾ secundum naturam

suam. | حَمَّةٌ لِمَدْنَةٍ أَمْ كَوَافِرُ
emit vitrum pro margarita
seu loco margaritæ.

7º *Expletiva est*: **וְקָרְבָּה**
egressus est. **וְתִדְבֵּר** **מְדֹבֶר** mor-
tui sunt. **וְעַל** **מְעַל** **מִזְרָח** surge.

8º *Præmittitur variis nominibus vel partic. ad novas particulæ efficiendas: اَفْتَ*
versus, حَذَنْ extra, لَحْمَنْ
intra, حَمَنْ quare? نَصْفَنْ
seorsum, حَلَّ supra, لَهَنْ
infra, حَمَنْ dextrorum,
etc.

٩° copulativa est : حَتَّىْ كُنَّا مُعْلَمًا
inter me et te. حَتَّىْ كُنَّا مُعْلَمًا
hominem inter et mulierem.
حَتَّىْ كُنَّا مُعْلَمًا inter illum et
patrem ejus. حَتَّىْ كُنَّا مُعْلَمًا
حَتَّىْ كُنَّا مُعْلَمًا inter Patrem et
Filium et Spiritum Sanctum.

$\hat{\mu}$ Est particula:

1º *negativa*, heb. נִבְרָא, ar. نَبْرَأ, non, nequaquam; ﻻ وَلِ ﻻ ne timeas; *adhibetur elliptice præsert. in juramento* pro minime: ﻻ ﻣَنْمَنْسًا ﻻ minime per Christum. ﻻ ﻢَنْمَنْسًا ﻻ minime, Domine. ﻻ ﻢَنْمَنْسًا ﻻ alioquin non; c. interrogat., nonne?; c., relativo: ﻻ, qui, quæ, quod

non, cui non; *conjunct.*, ut
non, ne; c. أَفْلَأْ... o ne-
que; نُو... نُو *vel* نُو... نُو ne-
que nec; c. أَمْ بِلْ: أَمْ ut
non; c. جَلْ: جَلْ priusquam; c.
duplici negat.: أَعْلَمْ بِنْ
ne unus quidem læsus est.
أَنْ مَسْكَمْ لَمْ تَقْدِمْ لَمْ
non quod timeam, ideo non
egredior.

3º **Δή** **ν** et contr. **Δέ**, ar. **لئى**,
non est, v. s. **Δή** et **Δέ**.

4º *Adhibetur ν cum verbo λογίῳ
ad negationem magis confirmandam, et tunc uno pluribusve vocibus a verbo separatur et occultatur sonus ο : ν*

وَمَهْلَكَةً أَحَدَهُمْ لِمَنْ nequa-
quam patrem suum occidit.

nonne Moyses dedit vobis legem ? **لَا** مُمْكِنٌ أَنْ يَعْلَمَ مَنْ
multi sunt qui inveniuntur vere credentes.

לְמָעַם, pl. *pler.* לְמָאָה, *heb.* מִנְחָה, f.
 לְמָתָתָה; 3^a pl. לְמָתָתָה, f., *f.*
 לְמָתָתָה et לְמָתָתָה; 2^a pers. לְמָתָתָה, f.
 לְמָתָתָה; 1^a pl. לְמָתָתָה; fut. מִתְמָתָה, pl.
 מִתְמָתָה, *nng.* מִתְמָתָה, f. מִתְמָתָה;
imper. לְמָתָתָה, f. לְמָתָתָה, pl. וְלָתָתָה;
infin. מִתְמָתָה, *fessus est,* labora-
 vit; מִתְמָתָה et fatigati sumus.
Part. act. לְמָתָתָה, *emph. et abs.*
f. לְמָתָתָה, *f. emph.* מִתְמָתָה, *pl.* לְמָתָתָה,
f. לְמָתָתָה; لְמָתָתָה laboramus; *ad-*
ject. laboriosus. *Part. pass.*
 לְמָתָתָה, *pl.* לְמָתָתָה, *emphat.*
 לְמָתָתָה, *f.* מִתְמָתָה.

Ethpe. ἀταξία defatigatus est.
Aph. ἀπό et ἀπέ defatigavit.
Part. ἀπλάνη, vel ἀπλάνη, f. ἀπλάνη.
 Ἀλογόν et Ἀλογόν, st. c. Λόγον, pl.
 Ἀλογόν defatigatio, labor: c. aff.
 Λογοτεχνίη eorum labor, etc.

λύκος λαγών, *lepus animal*
et *constellatio*; it. **λόγος**, ser-
mo.
λαγός et **λαγόντι** λαγώνους,
lagopus planta (*gall.* pied-de-
lièvre).

لَفْتَنْ, vox lat., legatum.
لَهْلَمْ, v. s. **لَهْلَمْ**:
لَوْلَمْ folium lauri.
لَوْلَمْ λέων, leo animal et Zo-
diaci signum.
لَهْلَمْ λαχός, populus, gens.

لَمْ	<i>inuisit. - cfr. aethiop. et</i>
<i>ar.</i> لَمْ, nuntium misit.	
مَلَائِكَة , مَلَائِكَة	missus, nuntius,
<i>inde</i> legatus, Angelus, <i>heb.</i>	
مَلَائِكَة	مَلَائِكَة; مَلَائِكَة, et
مَلَائِكَة	مَلَائِكَة Archangeli.
مَلَائِكَة	angelice.
مَلَائِكَة	angelicus.
مَلَائِكَة	missio.

كَحْتَن, pl. **كَحْتَنَات**, *et* **كَحْتَن**, *heb.* **לְכַחַת**, *ar.*
لَبَّ, *cor, animus, mens; me-*
dulla; trop. medium rei, cen-
trum. **كَحْتَنَة** *antilena, ar.*
لَبَّة *summa pars pectoris; it.*
medulla, ar. **لَبَّا**; **أَوْكَهْ**
in mente habuit. **أَوْكَهْ** *مُكَحْتَنَة*
id. **أَوْكَهْ** *مُكَحْتَنَة* *in ejus cor*
ascendit: in mentem ei oc-
currit. **أَوْكَهْ** *مُكَحْتَنَة* *in cor*
ejus injecit: eum movit. **أَوْكَهْ**
أَوْكَهْ *communicavit ei cogi-*
tationem suam. **كَحْتَنَة** *مُكَحْتَنَة* *ex*
corde, sponte; memoriter.
فَرَقَ *مُكَحْتَنَة* *mente, memoria*
distincte retinuit.
كَحْتَنَة *placenta, dulciaria.*
Pa. **كَحْتَن** *v. denom., animum*
addidit, incitavit; conforta-
vit, recreavit.
Ethpa. **أَكَّاحَت** *pass.*
كَحْتَنَة *animo fortis, strenuus,*
audax.
كَحْتَنَة *fortiter.*
كَحْتَنَة *fortitudo, audacia.*
كَحْتَنَة *ad cor spectans; quod*
ex animo est.
كَمَكَحْتَنَة *confortatio, incitatio;*
solamen.
مُكَحْتَنَة *hortatorius.*
كَمَكَحْتَنَة *ut مُكَحْتَنَة*.

دج, fut. نَدَهْ وَ condensavit, coagmentavit; cfr. ar. دَجَّبَ . Part. pass. حَبِّا, دَجِّبَا adject. densus, spissus; crispans *capillus*.

Ethpe. أَدْجَنْ ا pass.

Pa. كَثَرَ coagulavit; crispari sivit *crines*.

Ethpa. أَكْثَرْ ا pass.

كَثْرَا condensatio.

حَمْبُونْا id.; densitas.

كَبْرُوا et كَبْرَةْ forceps veterinarii, pers. نَبْدَار labia tenens.

دج inus.; cfr. ar. بَطْ calcitravit.

Pa. كَثَرَ impulit, excitavit, instigavit.

Ethpa. أَكْثَرْ ا pass.

حَمْلَا et كَهْلَا incitatio, instigatio; ictuum inflictio.

كَهْلَةْ mensuræ nomen.

كَهْلَةْ incitatio.

مَكْهُولَا excitatorius; hortatorius.

مَكْهُولَةْ et لَهْلَةْ incitatio.

دج, fut. نَدَهْ, prehendit, tenuit; cepit, retinuit; continuuit, comprehendit, de vase; cohibuit, pler. c. كَهْ;

obtinuit, memoriter retinuit; intrans. continuus fuit, duravit; fixa est in terra *arbor*;

دَجَّبَ أَهْمَلْ iter suscepit.

دَجَّبَ حَمْلَةْ domi mansit.

دَجَّبَ حَمَّلْ manibus plausit.

دَجَّبَ مَوْمَنْ قَاتِلْ مَهْمَلْ animalum a vanis *sæculi* pompis avertit.

كَهْلَةْ كَهْلَةْ benigne eum excepit.

دَجَّبَ دَجَّبَا retinuit consuetudines.

دَجَّبَ دَجَّبَا jejunium incepit.

دَجَّبَ دَجَّبَا sententiam tenuit, amplexatus est.

دَجَّبَ دَجَّبَا saltationem instituit: saltavit. Part. pass.

دَجَّبَ دَجَّبَا sæpius c. sensu act.

prehendens, retinens, etc.; دَجَّبَ دَجَّبا pugnam movens, decertans.

مَعْلِلْ دَجَّبَا sermo intricatus; subst. pos-

سَوْسَرْ دَجَّبَتْessor, præses; دَجَّبَ دَجَّبَا bibliothecarius.

Ethpe أَدْجَنْ ا pass.; it. argutus est; condensatus est aer, coagmentatus est.

Aph. أَدْجَنْ apprehendere fecit; tenere, accipere fecit; tradidit, edocuit.

دَجَّهَ دَجَّهَا prehensio; acquisitio. possessio; res intenta, incep-

tum.

دَجَّفَ prehensio.

دَجَّفَ دَجَّفَا prehensio;

trop. opportunitas (*gall.* pri-
se); res memoriter ediscenda,
spec. cantus. حَدَّهُمَا وَنُعْصَمَا
angustia respirationis.

حَدَّهُمَا tenens, retinens.

حَدَّهُمَا prehensio; *trop.* præ-
occupatio mentis, præjudi-
cium.

حَدَّهُمَا reprehensio injusta;
calumnia.

حَدَّهُمَا manubrium, capulus
gladii.

حَدَّهُمَا apprehensibilis, coe-
cibilis.

لَا مُهَمَّهُ حَفَّلَمَهُ adv. ; مُهَمَّهُ حَفَّلَمَهُ
immoderate.

حَدَّهُمَا et حَدَّهُمَا tumor in
uva palati; inflammatio fau-
cium; gingivæ.

حَدَّهُمَا ; cfr. heb. حَدَّهُمَا albus
fuit.

حَدَّهُمَا vel heb. حَدَّهُمَا , heb.
لَبَّوْنَهُ , ar. لَبَّوْنَهُ , thus.

حَدَّهُمَا et contracte حَدَّهُمَا f., ar.
لَيْتَ later, pl. حَدَّهُمَا later
albus, non coctus; lamina.

حَدَّهُمَا laterum confection; spe-
cies lateris.

حَدَّهُمَا , ar. مَلَبَنْ , modulus la-
terum; locus in quo confin-
guntur; fornax lateraria, heb.
حَدَّهُمَا .

حَدَّهُمَا حَدَّهُمَا , austera, africus ven-
tus.

حَدَّهُمَا , v. s. حَدَّهُمَا .

حَدَّهُمَا , heb. حَدَّهُمَا , ar. لَيْسَ
fut. تُحَدِّهُ , induit, se induit;
trop. occupavit, invasit eum
spiritus, dolor etc.; حَدَّهُمَا
regnum suscepit. حَدَّهُمَا حَدَّهُمَا
dolor induit: doluit. حَدَّهُمَا أَمَّا se
instruxit. حَدَّهُمَا فَلَمَّا se
incarnavit Verbum. Partic.
pass. حَدَّهُمَا , حَدَّهُمَا indutus;
se induens: *trop.* possidens.
حَدَّهُمَا حَدَّهُمَا humana natura
indutus. حَدَّهُمَا حَدَّهُمَا morti
obnoxius; subst. in pl. homi-
nes armati, حَدَّهُمَا lorica cincti.
حَدَّهُمَا لَكْنَهُ Deo indutus (*gr.θεοφρόσυς*).
Ethpe. حَدَّهُمَا إِلَاحَدَهُ indutus est.

Aph. حَدَّهُمَا vestivit, c. acc.
pers. et rei; ornavit; *trop.*
affecit eum dolor.

Ettaph. حَدَّهُمَا حَدَّهُمَا pass.
حَدَّهُمَا vestis.
حَدَّهُمَا حَدَّهُمَا vestis; indu-
mentum.

حَدَّهُمَا حَدَّهُمَا vestiens, vestitor.
حَدَّهُمَا indutus, armatus.
حَدَّهُمَا vestitus, indutio.
حَدَّهُمَا vestis.

مَهْكُمَةٌ vestiendus.

أَدْعَمَةٌ, pl. أَدْعَمَاتٌ indumentum, vestis; velum quo tegitur calix.

أَدْعَمَةٌ indutio.

أَدْعَمَةٌ, v. s. دَعْمَةٌ.

أَدْعَمَةٌ, id. q. دَعْمَةٌ.

أَعْسَى - usit. in part. pass.

أَبْلُوْتِيْنْسٌ balbutiens.

أَلْجِنْسٌ lingua.

Palp. أَبْلُوْتِيْنْسٌ, ar. لَجْنَجَةٌ et لَفْلَمَةٌ, balbutivit; per extens. confuse scripsit, male pronuntiavit; trop. verbis blandita est mater infantem. Part.

أَبْلُوْتِيْنْسٌ, مَكْبُرَةٌ مَكْبُرَةٌ balbutiens, balbus.

أَبْلُوْتِيْنْسٌ balbus; linguæ obligatio.

أَبْلُوْتِيْنْسٌ balbuties.

أَبْلُوْتِيْنْسٌ, v. s. دَعْمَةٌ.

أَئْنِيْجَمَا - Pa. أَبْلُوْتِيْنْسٌ, ar. لَقْزٌ, ænigmata locutus est.

أَئْنِيْجَمَا ænigma.

أَلْجَمَةٌ, مَهْكُمَةٌ, v. دَعْمَةٌ.

أَلْجَمَةٌ, مَهْكُمَةٌ, pler. f., pl.

أَلْجَمَةٌ, مَهْكُمَةٌ, دَعْمَةٌ, vox lat., legio; diabolus. لَبِّيْنْسٌ diabolus.

أَلْجَمَةٌ, ar. إِجَامٌ, frænum.

أَلْجَمَةٌ id.; mandibula, maxilla, cfr. دَعْمَةٌ.

أَلْجَمَةٌ cynara herba, cardus.

أَلْجَمَةٌ لَجَاجِنْسٌ, lagana, placenta.

أَلْجَمَةٌ f., لَاجِنْجَوْسٌ, lagena.

أَلْجَمَةٌ كَمْبُرَةٌ dimin., laguncula.

أَلْجَمَةٌ emph. أَلْجَمَةٌ et أَلْجَمَةٌ gr. لَهْلَجَرْنِ, st. c. أَلْجَمَةٌ, pl. أَلْجَمَةٌ contr. a أَلْجَمَةٌ, pers.-ar. كَمْبُرَةٌ, paropsis, catinus; mensura; cfr. دَعْمَةٌ id.

أَلْجَمَةٌ dimin. pl., patellæ.

أَلْجَمَةٌ, pl. أَلْجَمَةٌ ut أَلْجَمَةٌ.

أَلْجَمَةٌ leuca, mensura distantiae.

أَلْجَمَةٌ, contractum a أَلْجَمَةٌ sulcus.

أَلْجَمَةٌ كَبِيرَةٌ et كَبِيرَةٌ, it. لَادَنْجَهُمْ لادанum gummi, ar. لَادَنْ .

أَلْجَمَةٌ ex دَعْمَةٌ et pron. أَلْجَمَةٌ, ipsi viro, f. دَعْمَةٌ, ipsi mulieri, pl. دَعْمَاتٌ, f. دَعْمَاتٌ.

أَلْجَمَةٌ inus.; cfr. دَعْمَاتٌ, دَعْمَةٌ et دَعْمَةٌ defatigatus est.

أَلْجَمَةٌ defatigans.

أَلْجَمَةٌ et مَلْجَمَةٌ molestus, tædiosus.

أَلْجَمَةٌ دَعْمَاتٌ et دَعْمَاتٌ defatigatio.

Schaph. دَعْمَةٌ incantator, magus fuit.

حُمَّا desiderium ardens,
objectum desiderii.

حُمَّا مُهْمَّا ardens desiderium.

لُكَّا inus.; ar. لُكَّا, anhelavit.
Pa. لُكَّا anhelavit.

لُكَّا vel لُكَّا, anhelitus;
asthma.

أَكَّا compos. ex أَنْ et أَنْ, partic. negationis : non, nec, neque, it. interrog. nonne ?
ex. أَكَّهُ دَمَّهُ دَمَّهُ دَمَّهُ nonne hic est quem querunt interficere? أَكَّهُ nihil, res nihil. أَكَّهُ أَكَّهُ nonnihil, aliquid. أَكَّهُ أَكَّهُ ... أَكَّهُ non solum ... sed etiam. أَكَّهُ أَكَّهُ non multum; raro. أَكَّهُ أَكَّهُ non impotentes: possunt. أَكَّهُ أَكَّهُ imperfekte; in prop. nominalibus aequivalet: أَكَّهُ et verbo ar. أَكَّهُ أَكَّهُ أَكَّهُ وَكَتَلَ : آيسَ non pauci sunt nec rari.

أَكَّا, fut. أَكَّا imper.
أَكَّا, f. أَكَّا, comitatus est, socium se dedit; adhaesit.
Part. act. أَكَّا ; كَمْأُومٌ ; كَمْأُومٌ et مَكْمَمَةً مُهْمَّةً ad usque mortem cum secuti sunt.

Part. pass. حُمَّا, f.
emph. حُمَّا; subst. v. infra.
Ethpe. أَكَّا id.; se dedit operi, c. ح.

Pa. أَكَّا socium se fecit, comitatus est; deduxit, spec. ad sepulchrum. أَكَّهُ وَمَدْ كَمْهُ دَوْكَمَا et me deducite ad sepulchrum cum orationibus.

Ethpa. أَكَّا pass.; it. act. id. q. Pa. أَكَّا دَسْبَا أَكَّا in unam ecclesiam coaluerunt.

Aph. أَكَّا comitatus est; deduxit.

حُمَّا comitatus; funus.
أَكَّا comites, socii ejus.
أَكَّا حُمَّا artemisia herba (gall. armoise).

حُمَّا, pl. حُمَّا socius, comes; f. حُمَّا, pl. حُمَّا concentus.
أَكَّا comitatus.

حُمَّا comitatus, societas; funus. حُمَّا socius.
أَكَّهُ وَمَكْتَمَشًا concentus.
أَكَّا et كَمْأُومٌ comitatus, societas, spec. deductio ad sepulturam; exsequiae.

مَكْمَمَةً comes; dedueens ad tumulum.
أَكَّا et مَكْمَمَةً مُهْمَّةً societas.

بَلْ وَلِي et كَمْأُومٌ, Levi, a rad.

- حـمـ et heb. דָוָה adhaesit.
حـمـ, f. حـمـا, pl. حـمـا, f. حـمـا, f. levitae.
حـمـا levitae officium.
حـمـ partic. desiderii, admirationis, cfr. ar. نـى et تـىتـى, utinam! نـى حـمـا وـى utinam hoe non fuisset!
حـمـا, حـمـا, طـرـا, Levian, draco; diabolus.
حـمـ vel حـمـا λοβός, siliqua; phaseolus, ar. نـىـيـاـ.
حـمـ λόγος, sermo.
حـمـ, pl. حـمـا id; oraculum.
حـمـ λογισμός, ratio-cinatio, cogitatio.
حـمـ λογικός, rationalis, logicus.
حـمـ et حـمـا λογική, ars logicae.
حـمـ λογιστάι, logistae, publicani; curatores urbium.
حـمـ vox lat., ludus, amphitheatrum.
حـمـ gladiator; latro.
حـمـ verb. denom., gladiator fuit; latrocinated est.
حـمـا ars gladiatorium.
حـمـا turma.
حـمـ, heb. תـוֹזֵז et ar. تـوـزـ, amygdala, arbor et fructus.
حـمـا, ar. تـوـزـ, heb. לוֹחַ,

- tabula. حـمـا وـىـتـا tabula Alphabeti. حـمـا وـقـنـتـا tabula lectionis. حـمـا مـبـشـا tabulae mentium: memoria, animus.
حـمـ, fut. حـمـا maledixit, imprecatus est, exsecuratus est; excommunicavit. Part. act. حـمـا. Part. pass. حـمـا cujus vita maledicta est.
Ethpe. حـمـا et حـمـا pass.
Pa. حـمـا dire maledixit.
حـمـا ut seq.
حـمـا, pl. حـمـا maledictio.
حـمـا et حـمـا maledicens.
حـمـا maledicens; qui tibi maledicunt.
حـمـا maledictus; excommunicatus.
حـمـا id. q. حـمـا.
حـمـا λωταξ̄, hariolus.
حـمـا et حـمـا λωτός, lotus herba.
حـمـا λόγγη lancea; it. ut seq.
حـمـا λήρνθος, vas vitreum.
حـمـا λυχνίς, lychnis herba (gall. agrostemma).
حـمـا λυχνίτις, lychnitis, planta e qua finut ellychnia.
حـمـا, pl. حـمـا cuspis lanceæ, etc.; trop. acumen.

كـمـ كـمـ suspide munitus.

كـمـ et كـمـ lorarius, artifex ephippiorum ; cfr. كـمـ .
ars conficiendi ephippia.

كـمـ , fut. كـمـ accessit.

Ethpa. كـمـ adductus est ; convenit; cfr. ar. إـلـأـمـ id., a لـمـ .

كـمـ propinquitas.

كـمـ convenientia ; de-
cus.

كـمـ quadrans, obolus.

كـمـ λοιμώδης , exitialis
plaga.

كـمـ λοιμός , pestis, lues ;
plaga.

كـمـ λογχίτης , lonchitis
(gall. lonchite, sérapia-lan-
gue).

كـمـ λοράτος , clarus, illus-
tris.

كـمـ præputium ; uterus.

كـمـ , fut. كـمـ , lambit.
Part. act. كـمـ , لـمـ ; cfr.
heb. دـوـش et ar. وـكـ lambit ca-
nis.

كـمـ vel كـمـ muscus, alga ;
maxilla.

كـمـ actio lambendi.
كـمـ et مـكـمـ id.

كـمـ , fut. كـمـ connexit,
conjunxit ; cfr. كـفـ et ar.
كـفـ id. Part. act. كـافـ .
Part. pass. كـفـ .

Ethpe. كـفـ أـلـكـفـ pass.

Aph. كـفـ ut Pe. ; Part. pass.
مـلـفـ .

كـمـ semper vivum, herba in
parietibus germinans ; arum,
dracunculus, ar. أـوـفـ (gall.
estragon) ; it. farina hor-
deacea.

كـمـ أـلـكـفـ textura, conne-
xio.

كـمـ conjunctio, connexio.
كـمـ id. ; al. sensum v. s.
كـفـ .

كـمـ مـحـ ، vide مـحـ .

كـمـ مـبـ ، vide مـبـ .

كـمـ لـيـزـ ، lyra.

كـمـ لـخـيـزـ ، laura, monaste-
rium.

كـمـ lorum , cfr. كـمـ ; it. zea.

كـمـ , heb. دـنـقـ , ar. كـفـ , fut.
كـمـ , depuit farinam. Part.
act. كـافـ et لـمـ . Part.
pass. كـفـ , subst. farina
subacta.

Ethpe. كـفـ أـلـكـفـ pass.

كـمـ depsio ; pasta.

كـمـ massa subacta, pasta.

كُمَا مُرْؤَمًا *pasta ægyptiaca*:
idololatria.

كُمَا subactor farinæ.

كُمَا *id.*

كُمَا depsio, subactio farinæ.

لَمْكَ, comp. *a* لَمْ et لَمْ, vel deriv. ex لَمْ adhæsit: apud, juxta, coram (*id. ac بَعْدِ*); c. motu, ad, erga, contra, adversus; لَمْ لَمْ لَمْ ad montem transivit. بَعْدِه

لَمْ لَمْ exierunt adversus Arabes: eos adorti sunt; it. quoad, secundum, quod attinet ad; c. ؟ id quod est apud لَمْ لَمْ لَمْ index *digitus*; c. suff. لَمْ لَمْ لَمْ , حَفَّاب, لَمْ لَمْ etc., apud me, te, etc. لَمْ لَمْ لَمْ apud hunc sanctum virum. لَمْ لَمْ لَمْ ex *apud ipsum*: ex parte illius. لَمْ لَمْ لَمْ لَمْ لَمْ egressi sunt a præsentia Pharaonis; لَمْ لَمْ لَمْ gramm. relatio; status constructus; لَمْ لَمْ لَمْ relativus.

Aph. لَمْكَ verb. *denom.*, con junxit; adjecit. Part. act.

لَمْكَ . Part. pass. لَمْكَ ; gramm. appositus.

Ettaph. لَمْكَ لَمْكَ pass. et refl.

لَمْكَ conjunctio, unio.

كُمَاً conjunctim.

لَمْكَ et لَمْكَ conjunctio; gramm. relatio, affixio, *id. q. ar.* إِضَاقَة.

لَمْكَ ap. gram., affixus. لَمْكَ conjunctio.

لَمْكَ, fut. لَمْكَ læsit, molestiæ fuit; cfr. ar. لَمْكَ et لَمْكَ ursit. Part. pass. لَمْكَ ; adject. molestus.

Ethpe. لَمْكَ vexatus est.

Aph. لَمْكَ ursit; vexavit. Part. act. لَمْكَ , لَمْكَ urgens, vexans; molestus.

Ettaph. لَمْكَ pass.

لَمْكَ, st. c. لَمْكَ , pl. لَمْكَ , vexatio; molestiæ; nugæ.

لَمْكَ molestus.

لَمْكَ id. q. لَمْكَ .

لَمْكَ molestus; noxius.

لَمْكَ molestia.

لَمْكَ id. ; damnum.

لَمْكَ et لَمْكَ لَمْكَ lapis lazuli, pers. - ar. لَازُورْد.

لَمْكَ, fut. لَمْكَ , abstersit; delevit; cfr. ar. لَجَى abrasit.

Ethpe. لَمْكَ passiv. ; gram. elisus est.

Aph. لَمْكَ id. q. Pe.

لَمْكَ abstersio, deletio.

لَمْكَ deleter.

لُّ مُهَمَّتٌ مَكْسِتَرٌ delebilis ; مَكْسِتَرٌ indebilis.

مَكْسُورٌ et مَكْسُورٌ ventilabrum, ar. مِنْجَبٌ instrumentum ad decorticandum.

حُسْنٌ v. s. سَبَقٌ .

لَمْسُورٌ , fut. لَمْسَهُ lambit, linxit ; ar. لَمَسَ , لَمَسَكَ et heb. لִמְסַקֵּד id.

Pa. لَمْسُورٌ sæpe linxit.

حُسْنٌ linctus.

حُسْنٌ et حُسْنٌ plantago major herba (gall. plantain).

مَكْسِخَةً | مَكْسِخَةً | linctus.

لَمْسُورٌ , fut. لَمْسَهُ blanditus est, adulatus est ; caudam motitavit canis.

Ethpalp. لَمْسَهُ blanditus est, illectus est.

كَسْهَمٌ et كَسْهَمٌ blandities, blanditiæ canis per agitatem caudæ.

كَسْهَمَهُنْ | it. كَسْهَمَهُنْ | et كَسْهَمَهُنْ | blandiens, adulator.

كَسْهَمَهُنْ | blanditiæ.

لَمْسُورٌ , fut. لَمْسَهُ , congruit, convenit ; concors fuit ; cfr. ar. مَكْسُورٌ compactus fuit, cohaesit. Part. act. مَكْسُورٌ , مَكْسُورٌ ,

conveniens, aptus ; dignus.

Part. pass. حُسْنٌ , aet. minans, impugnans, hostilis ; لَمْسَهُ in aliquem iratus ; pass. impugnatus, minis lacessitus ; cfr. heb. לִמְסַקֵּד id., et ar. لَمْسَهُ carnem laceravit, occidit.

Ethpe. لَمْسَهُ coaptatus est, compactus est, cohæsit ; convenit ; minatus est, c. لَمْسَهُ vel لَمْسَهُ ; imminens fuit periculum.

Pa. لَمْسَهُ composuit, coaptavit, ar. لَمْسَهُ id.; it. ordinavit ; attribuit ; comminatus est. Part. pass. مَكْسُورٌ , مَكْسُورٌ aptus, conveniens ; harmonicus cantus.

Ethpa. لَمْسَهُ pass. ; minatus est.

كَسْهَمٌ , كَسْهَمَهُنْ , حُسْنٌ , panis ; cibus, viaticum ; convivium ; cfr. لَمْسَهُ cibus, præs. pinguis ut panis, ar. لَمْسَهُ caro ; c. aff. كَسْهَمٌ panis meus ; كَسْهَمَهُنْ panis ejus, كَسْهَمَهُنْ panis eorum, etc. حُسْنٌ أَفْتَأْنَانِ | vel كَسْهَمَهُ وَأَفْتَأْنَانِ | panis propositionis.

كَسْهَمٌ panis vivus : sancta Eucharistia. حُسْنٌ سَنَتَنِ |

كَسْهَمَهُنْ وَإِنْهَا | panis vitæ : id. كَسْهَمَهُنْ | panis mysticus : id. كَسْهَمَهُنْ |

حَسْدٌ مَحْدُودٌ وَمَهْدٌ lichen.

panis humilis : panis azymus.

حَسْدٌ مَهْدٌ panis communis, profanus.

حَسْدُونا congruentia ; comminatio.

حَسْدُونَةً convenienter, apte.

حَسْدُونَاهُ اَوْ حَسْدُونَاهُ اِلَيْهِ congruentia, convenientia ; dispositio.

حَسْدُونَاهُ conveniens, aptus.

حَسْدُونَاهُ اَمْ comminatio.

حَسْدُونَاهُ comminatio ; ira.

حَسْدُونَةً apte, concinne.

حَسْدُونَاهُ اَمْ convenientia; apta dispositio, harmonia ; compago.

حَسْدُونَاهُ dispositor ; artifex.

حَسْدُونَاهُ ordinatus.

حَسَنٌ, fut. **حَسَنٌ** et **حَسَنٌ** susurravit, submissim locutus est ; incantavit, verbis demulsit ; *cfr.* ψιλό sibilavit, mussitavit, incantavit.

Ethpe. **حَسَنٌ** submissim, secreto dictus est.

Pa. **حَسَنٌ** mussitavit ; secreto dixit ; arcana sibi dixerunt.

Ethpa. **حَسَنٌ** pass. ; it. act. ut *Pa.*

حَسَنٌ incantatio.

حَسَنٌ et **حَسَنٌ** susurratio,

murmur ; incantatio, incantamentum, amuletum ; *cfr.* heb. לְחַשֵּׁר מִ

حَسَنٌ incantator.

حَسَنٌ incantatio.

حَسَنٌ susurratio ; incantamentum.

حَسَنٌ susurro.

حَسَدٌ, pl. **حَسَدٌ** vola manus, *cfr.* **حَدَّهُ** ; it. halitus, afilatus, *cfr.* ar. آهَ انhelavit.

حَدَّهُ, fut. **حَدَّهُ** abrasit.

Ethpe. **حَادَهُ اِلَيْهِ** pass.

حَدَّهُ abrasio ; acies, acumen ; sudis (*gall.* picu, échalas).

حَدَّهُ اَوْ حَدَّهُ pistacia, pistacia terebinthi (*ar.* فَشَق). **بَطْمَهُ**.

حَدَّهُ اَوْ حَدَّهُ اَوْ حَدَّهُ λαθάρες, mendicus ; homo vilis.

حَدَّهُ, fut. **حَدَّهُ** decoratis, rasit, polivit ; denudavit *ensem*.

Ethpe. **حَادَهُ اِلَيْهِ** pass.

حَدَّهُ erasio, frictio.

حَدَّهُ وَحَدَّهُ et **حَدَّهُ وَحَدَّهُ** λειτουργία, liturgia, pl. **حَدَّهُ وَحَدَّهُ**.

حَدَّهُ وَحَدَّهُ αὐλητρία, έδος, tibicen, *inde pro Syris*, musica ; cantator.

كـهـنـهـ verb. denom., cecinit,
psallit; celebravit.

كـهـلـهـ, fut. **كـهـلـهـ**, acuit, po-
lavit, ar. طـسـ malleo percus-
sit; trop. instigavit. **كـهـمـهـ** ferrum percute-
dum calidum est. Part. pass.
كـهـمـهـ; trop. acutus,
solers.

Ethpe. **كـهـلـهـ** pass.

كـهـلـهـ exacutio.

كـهـمـهـ qui acuit.

كـهـمـهـ exacutio, levigatio,
acies; incitatio.

كـهـمـهـ cos.

كـهـمـهـ et **كـهـمـهـ** **كـهـنـهـ**, ven-
tus africus.

كـهـنـهـ vox lat., libellus.

كـهـنـهـ et **كـهـنـهـ** **كـهـنـهـ**,
thus; cfr. نـيـنـهـ et id.

كـهـنـهـ statim, cito; saepius re-
petitur: **كـهـنـهـ** vel **كـهـنـهـ**.

كـهـنـهـ cito; temere.

كـهـنـهـ vel **كـهـنـهـ** legatum.

كـهـنـهـ **كـهـنـهـ**, fuligo (gall.
suie).

كـهـنـهـ **كـهـنـهـ**, litaniae.

كـهـنـهـ **كـهـنـهـ**, c., libra, pl. **كـهـنـهـ**
et **كـهـنـهـ**; cfr. ar. رـطـلـ.

كـهـنـهـ **كـهـنـهـ** seu **كـهـنـهـ**, nitrum.

كـهـنـهـ vel **كـهـنـهـ** **كـهـنـهـ**, lichen

planta.; it. callum in genu
equi.

كـهـنـهـ nox, v. **كـهـنـهـ**.

كـهـنـهـ nux avellana.

كـهـنـهـ **كـهـنـهـ** **كـهـنـهـ**, limonium
planta (gall. statice).

كـهـنـهـ **كـهـنـهـ**, fames.

كـهـنـهـ, gr. med. **كـهـنـهـ** **كـهـنـهـ**,
limes.

كـهـنـهـ et **كـهـنـهـ** **كـهـنـهـ**, na-
vium statio, portus.

كـهـنـهـ **كـهـنـهـ**, lacus.

كـهـنـهـ **كـهـنـهـ** **كـهـنـهـ**, lem-
nisci, signa in manuscriptis.

كـهـنـهـ **كـهـنـهـ** **كـهـنـهـ** **كـهـنـهـ**, ar. نـفـنـهـ, mustela, ich-
neumon (gall. rat de Pharaon).

كـهـنـهـ **كـهـنـهـ** **كـهـنـهـ** **كـهـنـهـ**, lino-
zostis planta (gall. mercur-
riale).

كـهـنـهـ **كـهـنـهـ** **كـهـنـهـ** **كـهـنـهـ**, nymphaea (gall. néufar).

كـهـنـهـ et **كـهـنـهـ** **كـهـنـهـ** **كـهـنـهـ**,
febris acuta.

كـهـنـهـ et **كـهـنـهـ** **كـهـنـهـ** **كـهـنـهـ**.

كـهـنـهـ, v. **كـهـنـهـ**.

كـهـنـهـ et **كـهـنـهـ** **كـهـنـهـ**, paropsis,
catinus, pelvis.

كـهـنـهـ contr. ex **كـهـنـهـ** et **كـهـنـهـ**,

ar. تـيـنـهـ non est, non sunt;

c. aff. **كـهـنـهـ** non est ille, f.
كـهـنـهـ non est illa; **كـهـنـهـ**

non sunt illi, etc. حَسْنٌ vel

بَلْ حَسْنٌ non ego : non amplius

vivo. حَسْنٌ حَسْنٌ non sunt, non

existunt. حَسْنٌ لَّا حَسْنٌ حَسْنٌ non

potest cognosci Deus. ؟ حَسْنٌ

non est quod, non licet, nefas

est. حَسْنٌ وَّ حَسْنٌ nemo est qui

dicat. حَسْنٌ أَكْتَرُ حَسْنٌ nulla est

necessitas, nullum opus ad.

Ethpa. حَسْنٌ لَّا v. denom., an-

nihilatus est, defecit, cessavit;

cfr. ar. id. a. لَا شَيْءٌ nihil.

حَسْنٌ non existens.

حَسْنٌ مَا non existentia, annihi-

latio; defectus. حَسْنٌ وَّ حَسْنٌ

deficiente præsule, seu cum
præsule carerent.

حَسْنٌ مَا annihilans.

حَسْنٌ مَا ut حَسْنٌ مَا .

حَسْنٌ مَا حَسْنٌ لَّا θάραγος,
lethargia.

حَسْنٌ مَا lethargice.

حَسْنٌ مَا et حَسْنٌ لَّا θάρος, lapis.

حَسْنٌ مَا ex حَسْنٌ مَا hic, huc ; seq.

حَسْنٌ مَا citra, infra. حَسْنٌ مَا حَسْنٌ مَا ab eo tempore et deinceps,

exinde. حَسْنٌ مَا حَسْنٌ مَا huc illuc.

حَسْنٌ مَا tumor in genu equi; v. حَسْنٌ مَا .

حَسْنٌ مَا , fut. حَسْنٌ مَا linxit; cfr.

حَسْنٌ مَا , λείγω et gall. lécher.

Ethpe. حَسْنٌ لَّا pass.

Pa. حَسْنٌ مَا id. q. *Peal.*

حَسْنٌ linetus.

مَحْسُونٌ id.

حَسْنَةٌ λύγυος, candelabrum.

حَسْنٌ , v. s. حَسْنٌ .

حَسْنٌ حَسْنٌ et حَسْنٌ حَسْنٌ f.

λέξις, lectio, dictio, sermo,
lingua.

حَسْنٌ حَلْخِينη̄ , helxine planta
(gall. pariétaire).

حَسْنٌ حَسْنٌ et حَسْنٌ حَسْنٌ λεξικόν, lexicon,
vocabularium, dictionarium.

حَسْنٌ حَسْنٌ dim. præc.

حَسْنٌ v. denom., voces dis-
posuit, lexicon fecit, gram-
maticam scripsit.

حَسْنٌ , ar. الإِكْسِير , elixir seu
argentum vivum.

حَسْنٌ perturbatio.

حَسْنٌ paropsis, id. q. حَسْنٌ .

➤

حَسْنٌ , fut. حَسْنٌ , vix usit.,
stultus fuit; cfr. حَسْنٌ .

Pa. حَسْنٌ stultum reddidit, pro
stulto habuit.

Ethpa. حَسْنٌ لَّا et حَسْنٌ لَّا , nnq.

حَسْنٌ لَّا stultus evasit; stulte
se gessit.

حَسْنٌ لَّا , it. حَسْنٌ لَّا , f. حَسْنٌ لَّا ,
pl. m. حَسْنٌ لَّا , f. حَسْنٌ لَّا ineptus,

stultus. حَسْنٌ لَّا , حَسْنٌ لَّا bruta quæ
herbam pascunt.

لَكُمْ stultitia.

لَكُمْ stultus.

لَكُمْ , nnq. لَكُمْ , it. abs.

لَكُمْ , emph. raro لَكُمْ ;

pl. abs. لَكُمْ , emph.

لَكُمْ , nox, cfr. heb. לְבָדָה ,

ar. لَيْلٌ . لَيْلٌ filius noctis

sue : spatium noctis durans.

لَكُمْ أَمْسِهِ لَكُمْ et أَمْسِهِ

spatium noctis et diei, pl.

أَمْسِهِ لَكُمْ أَمْسِهِ spatium

duplicis noctis dieique. حَتَّهِ

لَكُمْ papula, pustula noctis

somnum agitans.

لَكُمْ id. q. seq.

لَكُمْ , لَكُمْ , it. لَكُمْ

et لَكُمْ لَكُمْ nocturnus.

لَكُمْ , heb. لَامِيَة lamia, spec-

trum nocturnum (ar. غُول).

لَهُ particula explicationis et affirmationis, quae semper postponitur : nempe, scilicet; quidem, certe. لَهُ اَنْ لَهُ ego quidem.

لَهُ , a ✠ et مَوْ , vide مَوْ .

لَهُ لَهُ مَارِيَنْ , portus.

لَهُ , fut. نَدْمَهُ conjunxit,

connexit. Part. pass. لَهُمْ ,

لَهُمْ conjunctus ; applicatus.

Pa. لَهُ conjunxit, consociavit.

Ethpa. لَهُمْ pass. et refl.

لَهُمْ conjunctio.

لَهُمْ apta dispositio.

لَادْعُمْ بِهِ , لَادْعُمْ بِهِ discipulus,

f. لَادْعُمْ بِهِ , pl. لَادْعُمْ بِهِ ;

cfr. ar. تَنْبِيَه , et heb. הַלִּזְרֵד

a ذَرَهُ docuit.

لَادْعُمْ بِهِ disciplina ; collegium

discipulorum; novitiatus; profes-

sio monastica.

لَادْعُمْ v. denom. a لَادْعُمْ , fut.

لَادْعُمْ بِهِ discipulos, asseclas

fecit ; instituit, edocuit. Part.

pass. مَهْلَكْمَهْ بِهِ , مَهْلَكْمَهْ بِهِ ; ca-

techumenus.

Ethpa. لَادْعُمْ بِهِ discipulus factus

est, c. ✠ ; edoctus est ; aliquid

professus est ; se monachum

fecit.

لَادْعُمْ بِهِ disciplina, doctrina, ca-

techismus; institutio, schola ;

coll. discipuli; novitiatus, profes-

sio monastica ; monasterium.

لَادْعُمْ بِهِ discipulus.

لَادْعُمْ بِهِ praceptor ; institutor.

لَادْعُمْ بِهِ doctrina imbutus,

initiatus; discipulus, catechu-

menus; novitus.

لَهُ nomen duodecimæ litteræ

Syrorum.

لَهُمْ litteram ✠ continens, per ✠ scriptus.

لَهُمْ , ex ✠ et voce græca

μόργις , ægre, vix.

حَدْهَا pannus *vel* stratum coactile (*gall.* coussinet en feutre).

حَلَمْ, *fut.* **حَنَمْ** *id. q.* **حُنْمٌ**, collegit; *it. c.* *alio sensu*, vix usit. nisi in part. pass. **حَمْمَهُ** loquela præditus, loquens; rationalis.

Palp. **حَمْكَهُ** disseruit, enuntiavit; balbutivit.

Ethpalp. **حَمْكَهُ لِكَمْكَهُ** *pass.*

حَمْهَا *et* **حَمْهَمَا** locutio.

حَمْهَمَةٌ, **حَمْهَمَةٌ** enuntiatione, loquela.

حَمْفَرْيَا, **حَمْفَرْيَة** *et* **حَمْفَرْيَا**, **حَمْفَرْيَا**, *it.* **حَمْفَسْ** *et* **لَامْفَسْ**, **لَامْفَسْ**, *pl.* **حَمْفَتَأْيَا** *et* **حَمْفَاتَمْ**, lampas; meteora; fulgur.

حَمْهَمَةٌ *et* **حَمْهَمَةٌ**, *f.* **حَمْهَمَةٌ** **لَاتْرُونِيَّة**, *ar.* **لَاصَن**, latro, fur; furax.

حَمْهَمَةٌ *dimin. ejusd.*

حَمَّهُ *verb. denom.*, furatus est, deprædatus est. *Part. act.*

حَمَّهَا, **حَمَّهَمَا**, *pl.* **حَمَّهَمَةٌ**.

Ettaph. **حَمَّهَمَةٌ** direptus est, *a latronibus* spoliatus est.

حَمَّهَمَةٌ prædatorie, ad instar latronum.

حَمَّهَمَةٌ furtum, latrocinium.

حَمَّهَمَةٌ latrocinium.

حَدَّهُ, *fut.* **حَنَمَهُ**, gulæ

vel voluptatibus indulxit; *cfr. ar.* **لَمْ** lusit.

Ethpa. **حَلَّكَهُ** avidus fuit; gavisus est, gulæ *aut* voluptatibus indulxit, laceivit.

حَحْهَا, *f.* **حَحْهَمَا** gulosus, intemperans; laceivus.

حَحْلَمْ avide, intemperanter.

حَحْهَمَا aviditas; gula; jocatio.

حَحْهَمَا *et* **حَحْهَمَا**, *ar.* **لَعْبَة**, saliva, spuma.

حَحْهَمَا *et* **حَحْهَمَا** qui salivam ex ore emittit, spumans.

حَحْهَمَا, **حَحْهَمَا**, *f. emph.* **حَحْهَمَا** balbus, blaesus; *cfr. heb.* **לְבָשָׁה** barbare loquens.

Pa. **حَحْهَمَةٌ** *v. denom.*, balbutivit, blaesus fuit; *cfr. heb.* **לְבָשָׁה** *id.*

Ethpa. **حَحْهَمَةٌ** *balbus, blaesus factus est.*

حَحْهَمَةٌ balbuties.

حَدَّهُ, *fut.* **حَنَمَهُ** sonum emitit, spec. indistinctum; obscure *vel* barbare locutus est; *absol.* locutus est; cantavit; gramm. pronuntiavit; *cfr. heb.* **لَفَز** *et ar.* **لَفَز** obscure, ænigmatis locutus est. *Part. pass.* **حَمَّهَا**, **حَمَّهَا**; enuntiatus.

Ethpe. **حَادَّهَةٌ** *pass.* insusurra-

tus est; mystice designatus est.

حَدَّا sonus emissus, spec. confusus; vox, sermo; lingua, dialectus; cantus; gramm. pronuntiatio. **حَدَّا حَتْمًا** stylus propheticus.

حَكَّهُ confuse, barbare loquens.

حَمَدَهُا modus loquendi præcipitanter, barbare; lingua barbara.

حَدَّا locutio, cantus; ænigma.

حَدَّا قُسْدًا avium garritus.

حَنَّا ad sermonem spectans, ad dialectum pertinens.

حَمَدَهُا cantus, concentus.

حَنَّهُ *inus.*; cfr. ar. **طَعَّ**, linxit *pecus herbam.*

حَمَدَهُا كَهْدَهُا et **كَهْدَهُا** mandibula, maxilla; cfr. **كَهْهُا**.

حَمَّهُ, v. s. **حَمَّا**.

حَلَّهُ supra, v. s. **حَلَّا**.

حَدَّهُ, fut. **نَحَّهُ** mastica-

vit, et per extens. manduca-

vit, comedit. Part. pass.

حَمَّهُ; impers. **هَمَّهُ** man-

ducavit; cfr. heb. **הַלְּזִתָּה** Hiph.

v. *inus.* **أَعْصَى** et **أَعْصَى** *avile comedit.*

Ethpe. **أَحْتَهَ** pass.

Pa. **حَنَّهُ** voraciter comedit.

Ethpa. **أَكْهَاهُ** manducatus est.

Aph. **أَحْنَهُ** edendum dedit; it.

manducavit, minus rect. pro

Peal vel Pa. Part. pass.

مَهْدَهُ, **مَهْدَهُ**, f. emph.

مَهْدَهُ; subst. cibus.

مَهْدَهُ et **مَهْدَهُ** mandu-

catio. **مَهْدَهُ** *id.*; ingluvies.

لَخَّ, fut. **نَلَخَ** linxit, *id. q.*

لَخَّ. Part. act. **لَهَّا**.

كَهْمَهُ longam barbam habens,

barbatus.

أَكْهَاهُهُ et **أَكْهَاهُهُ** scabies.

كَهْهُ vola manus; cfr. **كَهْهُ**.

لَهَّهُ *inus.*; cfr. ar. **طَعَّ**

calcitravit.

Pa. **كَهَّهُ** excitavit, stimula-

vit.

Ethpa. **كَهَّهُ** pass.

لَهَّهُ, pl. **لَهَّهَاتُوں**,

لَهَّهَاتُوں, minutus; obolus.

كَهَّهُ **أَفْرِيْ**, africus ventus.

كَهَّهُ **قَاصِيَّانُوں**, pavo.

لَهَّ, fut. **كَهَّ** ordinavit, i.

q. **كَهَّ**; cfr. ar. **لَهَّ**, im-

plexuit, convolvit.

Ethpe. **أَكْهَاهُ** pass.

حُفْعًا complicatio; involucrum
epistolæ, etc.

حُفْصًا concha alba marina.

حُفْرًا, *heb.* אֲפָרֶד, simulacrum, idolum parvum; *it. opimus, splendidus; cfr. λιπαρός.*

حُفْرًا instrumentum torturæ

حُفْرًا et حُفْرًا, *ar.* حَفَّةٌ, rāpum.

حُفْرًا, *ex* حُفْرًا et حُفْرًا, secundum, *v. s. لَهْفَ.*

حُفْرًا et حُفْرًا لَامِا, حُفْرًا remus; *navis gubernaculum.*

حُفْرًا suburbium; regio.

حُفْرًا, *fut.* حُفْرًا, *heb.* حُفֵّ, *ar.* حَلَّ collegit, racematus est; attraxit. *Part. act.* حُفْرًا, حُفْرًا; *subst. f. in st. est.* حُفْرًا حُفْرًا electrum. حُفْرًا حُفْرًا psittacus.

Ethpe. حُفْرًا pass.

Pa. حُفْرًا collegit, selegit.

Part. act. حُفْرًا مُتَلًا; مُكْفَرًا مُتَلًا; garrulus.

Ethpa. حُفْرًا pass.

حُفْرًا illex, piscatoris seu venatoris illecebræ; esca; collectio.

حُفْرًا racematio; spicilegium.

حُفْرًا racemator; spicilegus.

حُفْرًا ut حُفْرًا.

حُفْرًا vestes acu pietas conficiens.

حُفْرًا, *al.* حُفْرًا collectio, collectanea.

حُفْرًا mixtura olerum.

حُفْرًا aridus.

حُفْرًا vestis pannosa.

حُفْرًا et حُفْرًا, *ar.* مِنْقَاطٍ, forceps, emunctorium.

حُفْرًا conflagratio, incendium.

حُفْرًا f., λεκτίκιον, lectica.

حُفْرًا et حُفْرًا lecticarius.

حُفْرًا λάγηνος et λεκάνη, pers. لَكَنْ, lagena, pelvis.

حُفْرًا inus. aut minus recte pro Pa.

Pa. حُفْرًا in serum protraxit, fructus serotinos collegit; *cfr. heb.* حُفֵّ *id.*

Ethpa. حُفْرًا اَكْحَمَ protractus est.

Aph. حُفْرًا ut *Pa.*

حُفْرًا serotina herba vel pluvia.

حُفْرًا serus, serotinus; *cfr. neo-ar.* أَقْيَسٌ *id.*

حُفْرًا sero, tarde.

حُفْرًا tarditas.

حُفْرًا et حُفْرًا حُفْرًا saccus magnus.

حُفْرًا et حُفْرًا حُفْرًا ληρός, stultus.

حُفْرًا حُفْرًا *id.*; nugax.

حُمْمَةٌ stultitia.

حُمْمَةٌ , heb. חַשְׁמָן , ar. حُمْمَةٌ , لِسَانٌ , lingua ; dialectus , sermo ; حُمْمَةٌ vel حُمْمَةٌ حُمْمَةٌ lingua arabica ; trop. lingua terræ ; lingula auri , flammæ . حُمْمَةٌ lingua agni : plantago (gall. plantain) حُمْمَةٌ فَحْمَةٌ lingua canis : lolium . (gall. ivraie) حُمْمَةٌ رُغْبَةٌ lingua passeris : fraxinus , ornus . حُمْمَةٌ lingua tauri : buglossum .

Pa. حُمْمَةٌ v. denom., pronuntiavit.

Ethpa. حُمْمَةٌ pass. ; it. verbis lacessivit.

Aph. حُمْمَةٌ ut Pa.

حُمْمَةٌ et حُمْمَةٌ loquax.

حُمْمَةٌ loquacitas.

حُمْمَةٌ loquacitas ; loquela.

حُمْمَةٌ enuntiatio, expressio.

حُمْمَةٌ pronuntiatio.

حُمْمَةٌ chlamydis foramen, vestis ansula.

حُمْمَةٌ , fut. حُمْمَةٌ convenit, pler. usit. in part. præs.

حُمْمَةٌ conveniens, conveniens fuit, consentaneus ; dignus.

Ethpe. حُمْمَةٌ machinatus est,

struxit insidias ; dolose se gessit.

Pa. حُمْمَةٌ , ar. حُمْمَةٌ , nnq. حُمْمَةٌ , inquinavit. Part. pass. حُمْمَةٌ ; dolosus.

Ethpa. حُمْمَةٌ turpiter vel fraudulenter se gessit.

حُمْمَةٌ convenientia, consensus.

حُمْمَةٌ conveniens.

حُمْمَةٌ machinatio, fraus.

حُمْمَةٌ dolose.

حُمْمَةٌ calliditas, malignitas, dolus ; turpitudo.

حُمْمَةٌ callidus, malignus.

حُمْمَةٌ , heb. حُمْمَةٌ , semicorus.

حُمْمَةٌ حُمْمَةٌ fraus, artificium, dolus.

حُمْمَةٌ , fut. حُمْمَةٌ pronuntiavit ; congregavit.

Ethpe. حُمْمَةٌ pronuntiatus est.

Pa. حُمْمَةٌ murmuravit ; collegit.

Ethpa. حُمْمَةٌ collectus est ; murmuravit.

حُمْمَةٌ et حُمْمَةٌ murmuratio ; calumnia.

حُمْمَةٌ murmurans ; obtrectator.

حُمْمَةٌ obtrectatio.

ج seu مَهْ decima tertia litera alphabeti Syrorum; vallet numerice: ج = 40, ج = 400, ج = 400000, ج = quadragesimus. Respondet, heb. م et ar. م. Permutatur ج in semiticis linguis c. ب, ب مُحَمَّدًا, heb. מְבֹל diluvium; زَمَانٌ, syr. أَحْمَنْ tempus; ج quando excidit in nom. a participiis Pa. formatis: مَسْكَنًا obstetrix pro مَسْكَنًا; مَحْبَوْفًا pro مَحْبَوْفًا superbus. مَعْ, particula juramenti; مَعْ سَيِّدًا per vitam ejus.

أَنْ, heb. אָנָה, ar. أَنْ, est: 1º pronomen 1º interrogativum et relat: quid? qualis? مَنْ كَمْ quid mihi et tibi? مَنْ كَمْ quidnam tibi est quod? كَمْ مَنْ quid ad nos? مَنْ كَمْ qualis nuntius tuus? quis status tuus? 2º relativum: id, id quod; cfr. آئِنْ, أَعْلَمْ ut id quod; وَمَنْ كَمْ مَنْ كَمْ quidquid facis bene est,

2º adverbium; quam! مَتَّى مَسْعَدْ; quantum amavi! مَنْ مَنْ مَنْ مَنْ مَنْ quam insulsus est liber ejus!: مَنْ مَنْ مَنْ مَنْ مَنْ مَنْ 3º conjunctio, seq. ؟ : quum, quando; quotiescumque. مَنْ مَنْ مَنْ مَنْ مَنْ مَنْ quando homo credit, amat. 4º novas particulas efformat cum مَنْ, مَنْ et مَنْ, ut: مَنْ مَنْ sicut, ex مَنْ et مَنْ; مَنْ ex مَنْ et مَنْ quoniam, quum; مَنْ مَنْ ut, ex مَنْ et مَنْ مَنْ quae videoas in suo loco; مَنْ مَنْ ex مَنْ et مَنْ, heb. لَمْ, ar. لَمْ, interrogat. ad quid? quare? quorsum? numquid? كَمْ مَنْ مَنْ مَنْ مَنْ si enim libertas non est, quorsum admonitio? dubitat. an forte? num forte? مَنْ مَنْ مَنْ ego sum, Domine? وَمَنْ مَنْ ex مَنْ et مَنْ, it. contr. ج, gr. μήτι, ad quid? quare? numquid? quorsum? وَمَنْ مَنْ مَنْ كَمْ مَنْ مَنْ مَنْ numquid potuerunt populum liberare? in interrogatione indir., num forte,

si forte ; *dubitative* : ne, ne forte. **مُهْمَّةً أَكْنِي وَحْدَتَ سَاهَ**

أَعْلَمْ interrogabantur si forte vidissent eos. **وَهُنَّ مُهْمَّاتٍ**

أَنْ ne forte in vanum eucurissem aut currerem. **وَتَنْهِي وَحْدَتَهُ**

تَسْهِي timens ne forte crescerent aquæ; *it.* *adhib.*

حَدَّا *ad prohibitionem exprimendam*: **سَبَبْ حَدَّا حَلَّسْ أَمْنَ**

أَيْدِيه vide, nemini dixeris, et *scepius c. 2^a pers. imperfec-*

تَحْمَلْتَ ne furtum facias.

مَالا vel, *heb.* **בְּאַהֲרֹן**, *ar.* **مَالا**

vel *מִתְ*, *c. præf.* **וּמְלָא**, etc., centum; *dual.* **מְלָאִים** *vel*

أَكْمَهْ ducenti. **وَحْدَتَهُ** *trecenti,*

أَوْحَدَتَهُ quadringenti, **سَعْمَقْتَهُ** quin-

أَمْنَتَهُ genti, **مَدَهُ** sexcenti, **أَمْنَتَهُ** *octingenti,*

أَمْتَهُ nongenti; *pl.* **مَالَاتْهُ** *et* **إِلَهَمَ**, *pl.* **مَلَّة** *et* **إِلَهَمَ**, centuria, centeni.

مَالَاتْهُ centuplex. **أَمْمَهُ** numerus centenarius.

مَالَاتْهُ *μαχγάς*, *آدَوَز*, pons citharae (*gall.* chevalet d'instruments à cordes).

مَالَاتْهُ, *v. s.* **مَنْجَنْهُ**.

مَابُونْجَفْ **βδέλησον**, *bdellium palma* (*ar.* **مُغْل**).

مَابُونْجَهُ **μαθόρωσις**, depilatio.

مَابُونْجَهُ **μ.α.χ.α**, ptisana; panis subcinericus, pulmentum ex hordeo et melle compositum.

مَابُونْجَهُ **μετάνοια**, pœnitentia; inclinatio profunda, prostrations.

مَابُونْجَهُ *et* **مَهْلَكَهُ** **μέταλλον**, metallum, fodina.

مَابُونْجَهُ, *v. s.* **مَخْرُب**.

مَابُونْجَهُ, *f.* **μηλωτή**, vestis pellicea.

مَابُونْجَهُ *et* **مَادَنْهُ**, **مَادَنْهُ**, *pl.* **مَادَنْهُنْهُ**, **مَادَنْهُنْهُ**

مَادَنْهُنْهُ *etc.* *et* **مَافَتَهُ** **μηγγανή**, machina; dolus, fraus.

مَادَنْهُ, *v.* **مَادَنْهُ**.

مَادَنْهُ **μελέτη**, *cura, sollici-*

مَادَنْهُ *tudo.* **مَادَنْهُ** *μαλιστَهُ*, *v.* **مَادَنْهُ**.

مَادَنْهُ *vox lat. codex membranaceus.*

مَادَنْهُ, *heb.* **בָּזָן**, *fut.* **مَادَنْهُ**, *f.* **مَادَنْهُ** *vel* **مَادَنْهُ**, *et minus recte*

مَادَنْهُ, **أَمْنَهُ**, fastidivit, aversatus est, *c. ت rei.* **مَادَنْهُ** *تَعْبَهُ* *et* **سَهْيَهُ** *imperson.* **مَادَنْهُ** **كَسْ**, me tæduit, abhorru;

مَدَّا لَمْ كُنْ ne tibi displiceat,
ne te tædeat, c. مَدَّ vel ى rei.
Part. act. مَدَّا ، مَدَّا ; impers.

مَدَّا لَمْ كُنْ me tædet. مَدَّا لَمْ كُنْ
ne animum despondeamus.

Aph. مَدَّا socors fuit, torpuit,
lassus fuit.

مَدَّا id. q. مَدَّا .

مَدَّا piger, socors, negligens ;
lassus.

مَدَّا مَدَّا tedium, pigritia,
negligentia, lassitudo ; deli-
quium animi. مَدَّا مَدَّا ۖ dili-
gentia.

مَدَّا negligenter, lente.

مَدَّا et مَدَّا , pl. مَدَّا , et
مَدَّا , مَدَّا , apparatus omnis,
suppellex, ar. مُرَأَةٌ ; it instru-
mentum, vas; cfr. مَدَّا vas; it.
vestis, arma ; مَدَّا apot-
heca, armarium. مَدَّا et
مَدَّا intestina. مَدَّا
vasa mysteriorum: vasa eu-
charistica.

مَدَّا , pers., مَيَّا vitrum.

مَدَّا et مَدَّا مَدَّا , mandragora.
μανδρόχυρος, mandragora.

مَدَّا μανία , insania.

مَدَّا id. q. مَدَّا v. s. مَدَّا .

مَدَّا partic. Pa. verbi مَدَّا .

مَدَّا id. q. مَدَّا v. s.
مَدَّا .

مَدَّا et مَدَّا serra, v. s. مَدَّا .

مَدَّا , v. s. مَدَّا .

مَدَّا μάκρη , asia (gall. ean-
nelle).

مَدَّا , part. Aph. مَدَّا .

مَدَّا id. q. مَدَّا , v. s. مَدَّا .

مَدَّا , v. s. مَدَّا .

مَدَّا μαχασμός , con-
sumptio, phthisis.

مَدَّا , v. s. مَدَّا .

مَدَّا , v. s. مَدَّا .

مَدَّا μαγός , mamma.

مَدَّا et مَدَّا μαθητής , μαθητα,

doctrinæ. مَدَّا مَدَّا et
مَدَّا مَدَّا مَدَّا مَدَّا
مَدَّا مَدَّا مَدَّا , pl. مَدَّا مَدَّا
mathematicus ; in pl. mathe-
maticæ scientiæ.

مَدَّس , v. s. مَدَّس .

مَدَّس , v. s. مَدَّس .

مَدَّا μαγγανικός , ballista.

مَدَّا

مَدَّا inus. insipidus fuit ; cfr.
ar. مَجَّ potum rejicit, insipi-
dum invenit. Part. pass. adj.
usurp. مَدَّا insipidus.

مَدَّا et مَدَّا , saporis
defectus, insuavitas.

مَدَّا , ar. مَاش , phaseolus, pisi
species.

مَدَّا et مَدَّا fructus, spec. siceus.

مَدَّا dim. præc. ; falx, aseia,
a rad. مَدَّا .

مَاجِلْلٌ, v. s. مَاجِلْلٌ.

مَاجِسْمُوسٌ Magismus.

مَاجِسْتُرٌ et مَاجِسْتُرٌ μάγιστρος, magis-
ter; praefectus.

مَاجِسْتُرٌ μάγιστριανός, mi-
nister, veredarius.

مَاجِنْهَا, مَاجِنْهَا, it.
مَاجِنْهَا et مَاجِنْهَا μάγειρος,
coquus; it. μαχειρέον, la-
gena. خَدَه مَاجِنْهَا culina.

مَالِلٌ, v. s. مَالِلٌ.

مَالِلٌ falx, v. s. مَالِلٌ.

مَالِلٌ, v. s. مَالِلٌ.

مَالِلٌ neo-græc. μωσῆλλα pus;
pituita.

Aph. مَالِلٌ v. denom., pura
exscreavit.

مَانِيٌّ, ar. مَانِيٌّ, gratis, gra-
tuito; sine pretio; frustra,
immerito.

مَانِيٌّ gratuitus.

مَانِيٌّ clypeus, v. s. مَانِيٌّ.

مَانِيٌّ et مَانِيٌّ μάγγανον,
machina seu rota aquaria;
cfr. ar. مَنْجُون.

مَانِيٌّ, مَانِيٌّ et
مَانِيٌّ f., magnes lapis

مَانِيٌّ, v. s. مَانِيٌّ.

مَانِيٌّ part. Aph. v. مَانِيٌّ et v. مَانِيٌّ.

مَانِيٌّ, pl. مَانِيٌّ pers.-ar.

مَاجُوسٌ, f. مَاجُوسٌ Magus, sec-
tator religionis Magorum;
per extens. Persæ; cfr. pers.
مَنْ, ignis cultor.

مَاجُوسٌ, ar. مَاجُوسٌ, Magus,
ignis cultor; magus, incan-
tator, magicus.

مَاجِنْهَا v. den., susurravit,
speciat. de susurratione ma-
gorum.

مَاجِنْهَا susurratio mystica mago-
rum.

Pa. مَاجِنْهَا verb. denom. magiam
exercuit; magicas incanta-
tiones fecit.

Ethpa. مَاجِلِي religioni Ma-
gorum adhæsit.

مَاجِسْمُوسٌ Magismus, ignis
cultus; pl. مَاجِسْمُوسٌ incanta-
tiones magicæ.

مَاجِنْهَا part. Aph. v. مَاجِنْهَا.

مَاجِنْهَا, fut. نَعْبَدٌ fugit, evasit.

Part. præs. مَاجِنْهَا, مَاجِنْهَا, effu-
giens. Part. præt. مَاجِنْهَا, مَاجِنْهَا id.

مَاجِنْهَا fuga.

مَاجِنْهَا fugam procurans; li-
berans.

مَاجِنْهَا fuga, effugium.

مَاجِنْهَا inus.; cfr. مَاجِنْهَا extendit.

Aph. مَاجِلِي, fut. نَعْبَدٌ et تَامِنٌ se
extendit, inde potuit, capax

fuit, suffecit ; *it.* effugit, liberavit ; *cfr.* مَهْلِكٌ *s. l.* *Part.* *act.* مَهْلِكٌ capax, par *rei*; لَا مَهْلِكٌ حَذَّرَهُ fugere non valuerunt ; *it.* fugiens ; libera-

rans.

مَهْلِكٌ liberator.

مَهْلِكٌ et مَهْلِكٌ fuga.

مَهْلِكٌ liberatio.

مَهْلِكٌ et مَهْلِكٌ , مَهْلِكٌ , assyr. mandattu, heb. מְדֻחָה, chald. מְדֻחָה tributum, *a rad.* chald. מְדֻחָה.

مَهْلِكٌ , ex مَهْلِكٌ et مَهْلِكٌ , particula illationis : igitur, itaque ; مَهْلِكٌ nunc ergo quod... مَهْلِكٌ et sic, hinc ergo.

مَهْلِكٌ , v. s. مَهْلِكٌ .

مَهْلِكٌ , مَهْلِكٌ , v. s. مَهْلِكٌ .

مَهْلِكٌ بِرْجِدِيَّةٍ , medica planta (gall. luzerne).

— Pa. مَهْلِكٌ sallivit, condivit ; trop. bene contexuit, concinnavit ; acuit *scriptum*.

Ethpa. مَهْلِكٌ pass.

مَهْلِكٌ et مَهْلِكٌ condimentum omne *ut sal, piper, etc.* مَهْلِكٌ

locus in quo parantur condimenta *vel aromata.*

مَهْلِكٌ mixtura ; paratio ; condimentum ; medicamentum mixtum.

مَهْلِكٌ mixtura.

مَهْلِكٌ et مَهْلِكٌ millepeda ; *cfr.* مَهْلِكٌ et مَهْلِكٌ .

مَهْلِكٌ repagulum portae ; trans- tra ; *cfr.* أَوْكَتْهَا .

مَهْلِكٌ haustum, *a rad.* مَهْلِكٌ .

مَهْلِكٌ contr. e chald.

pro مدْعَى ما , مدْعَى ما , scibile quid, *inde est* :

1º pronomen indefinit. utriusque generis et numeri : aliquid, quidquid, quidam, qui-libet; subst. in pl. مَهْلِكٌ res, negotia. وَهُوَ مَهْلِكٌ ut aliquid notum faciat. حَمْمٌ مَهْلِكٌ vel مَهْلِكٌ malum aliquid.

مَهْلِكٌ مَهْلِكٌ vel aliquid amplius.

مَهْلِكٌ مَهْلِكٌ aliquid quod manducatur : edule quid.

مَهْلِكٌ id quod ; quodecumque. حَفْنٌ مَهْلِكٌ in nonnullis ; ex parte.

سِكْنٌ مَهْلِكٌ sicut, prout. حَبْنٌ مَهْلِكٌ quidquid vobis dixerit, facite.

مَهْلِكٌ مَهْلِكٌ nonnulli, nonnulla ex ; paululum. حَمْمٌ مَهْلِكٌ aliquid panis.

2º adject. indef. ponitur ante vel post nomen aut pronom. :

إِنْ مَهْلِكٌ natio quædam.

مَهْلِكٌ مَهْلِكٌ nonnulli homines.

الْمَهْلِكَ مَهْلِكٌ aliquod signum.

مَهْلِكٌ مَهْلِكٌ unum quid.

كَلْمَهْلِكَ مَهْلِكٌ ad portum

quempiam. حَتَّىٰ مُنْهَا non nulli usus. هَذِهِ مُنْهَا illud quod. هَذِهِ مُنْهَا res illæ quædam. هَذِهِ مُنْهَا لَا مُنْهَا vel قَلَمْبُهُ مُنْهَا quidquid, omnia. حَلَّ مُنْهَا vel حَلَمْبُهُ مُنْهَا in rebus omnibus. حَفْظُهُ مُنْهَا إِسْنَانًا alia re; c. ۲ præc. vel seq., nihil, nihilum; nullus, nulla, nullum: لَا أَعْدَمْهُ مُنْهَا وَهُنْتَأْ حَسْنًا nullam causam deferebant. وَلَا هَمْخَا وَمُنْهَا sine ullo medicamento. مُنْهَا أَمْنَا وَ id quod, res quæ; مُنْهَا مُنْهَا bis repetita, adjecto sæpius وَ, varius, nonnullus: أَمْكَحْهَا مُنْهَا هَذِهِ varia quæsita. مُنْهَا أَمْنَا مُنْهَا كَهْ وَمُنْهَا مُنْهَا habebat ornamenta diversi generis. مُنْهَا هَذِهِ وَ اَنْتَ مُنْهَا et ex parte credo. مُنْهَا لَحْكَهَا حَمْدُهُ مُنْهَا pro variis rationibus.

3º adverb. : مُنْهَا لَا أَقْهَهُ أَنْهَ : nullo modo læserunt eum. هَبْنَا مُنْهَا quondam.

مُنْهَا quod quid est, existens; pl. f. مُنْهَاتُهَا entia. مُنْهَاتُهَا quidditas, essentia.

مُنْهَا مُنْهَا , v. s. وَهَا . مُنْهَا مُنْهَا , v. s. وَهَا .

مُنْهَا مُنْهَا et مُنْهَا مُنْهَا filum primum jugi textorii; cfr. مُدْرِيَا .

مُنْهَا مُنْهَا mens, v. s. مُنْهَا .

حَمْبُهُ , fut. نَعْدَهُ , ar. مَذَرْ , corruptus est, spec. de ovis; perperit.

Pa. مُنْهَا corruptit, vitiavit.

Ethpa. أَنْجَهُ مُنْهَا pass. ; it. pandiculatus est.

مُنْهَا , ethiop. et ar. مَدَرْ , terra, gleba, lutum.

Aph. أَمْبُهُ denom. a مُنْهَا , ut gleba confractus est.

مُنْهَا وَنْسَا et مُنْهَا وَنْسَا terrenus.

لَوْهُ مُنْهَا partus.

مُنْهَا وَنْهَا , f. مَهْوَلًا corruptus; scoriis commixtum argen-tum.

لَوْهُ مُنْهَا et لَوْهُ مُنْهَا corruptio.

مُنْهَا وَنْهَا scoria.

مُنْهَا وَنْهَا , v. s. وَهَا .

مُنْهَا وَنْهَا pro مُنْهَا وَنْهَا حُبْرَهُ مُنْهَا de novo, v. s. وَهَا .

مُنْهَا وَنْهَا fusus muliebris, v. s. مُنْهَا وَنْهَا , s. وَهَا .

مُنْهَا وَنْهَا , v. s. وَهَا .

مُنْهَا , ar. مَهَا , caveas! apage!

لَهُ مُنْهَا , fut. لَهُ مُنْهَا coxit, ebullivit.

Aph. لَهُ مُنْهَا ad ebullitionem usque duxit.

لَهُ مُنْهَا coctio, ebullitio.

نَّوْسَهُ id.; saporis expers.	
نَّوْسَهُ aquosus, <i>id. q. مَسْنَهُ</i> , <i>cfr. ar. مَهْرَ</i> aquosus fuit.	
أَلْعَنْسَهُ aquositas.	
دَنْسَهُ v. s. دَنْسٌ.	
أَكْنَهُ μεγαλεῖον, Evangelium.	
بَلْسَمَهُ balsamum, <i>id. q. بَلْسَمَهُ</i> .	
أَفْلَقَهُ μεταφυσικός, metaphysicus.	
مَلْكُوكَهُ μετρητής, mensura liquidorum.	
أَنْتَهُهُ مَرْجِعَنَخِي, machinæ bellicæ.	
مَلْمَهُ مَالَكَيَّ, <i>ar. مُلْكَيَّة</i> , malva.	
مَلْكَهُ مَلِكَيَّ, mel.	
أَنْكَهُ مَلِكَيَا, <i>arbor.</i>	
أَنْكَهُ مَلِكَيَّة, <i>arbor.</i> mælancholia, atra bilis.	
مَهْلَكَهُ مَهْلَكَهُ vox lat., membrana, pergamenta.	
مَهْلَكَهُ مَهْلَكَهُ μεσεντέριον, membrana in medio intestinorum, mesenterium.	
مَهْلَكَهُ مَهْلَكَهُ μέσπιλον, mespilus <i>arbor</i> (<i>gall. néflier</i>).	
مَهْلَكَهُ similitudo.	
عَوْسَهُ — <i>Usitat. in part. pass.</i>	
pro adj. usurpato: مَهْلَكَهُ,	
مَهْلَكَهُ, <i>ar. مَاهِر</i> , peritus, strenuus.	

Pa. بَرْتَهُ peritum fecit.	
Ethpa. بَرْتَهُ لِي peritus fuit; denom. a بَرْتَهُ dos, dotata est mulier.	
بَرْتَهُ part. <i>Aph. v. بَرْتَهُ</i> .	
بَرْتَهُ, heb. בְּרִית, <i>ar. مَهْر</i> , dominum nuptiale, dos.	
بَرْتَهُ et بَرْتَهُ dotatio.	
بَرْتَهُ perite.	
بَرْتَهُ peritia, scientia.	
بَرْتَهُ, <i>ar. مَهْر</i> , pullus equi.	
بَرْتَهُ noxious a form. <i>Aph. rad. بَرْتَهُ</i> .	
بَرْتَهُ مَهْلَكَهُ noxa, ab eodem.	
بَرْتَهُ, بَرْتَهُ etc. μέθοδος, methodus, ratio agendi, pl. بَرْتَهُ.	
بَرْتَهُ مَهْلَكَهُ μεθοδικός, methodicus, artificialis; peritus.	
بَرْتَهُ مَهْلَكَهُ μύωψ, ωπος; it. oestrus (<i>gall. taon</i>).	
بَرْتَهُ مَهْلَكَهُ μύουρος, myosurus herba (<i>gall. queue de rat</i>).	
بَرْتَهُ carbonaria fornax; <i>cfr. pers. بَرْتَهُ</i> ignis.	
بَرْتَهُ مَهْلَكَهُ μυγαλένη, mustela.	
بَرْتَهُ مَهْلَكَهُ μόργις, vix, ægre.	
بَرْتَهُ, pl. بَرْتَهُ, مَهْلَكَهُ et بَرْتَهُ vox lat., modius mensura; <i>cfr. ar. مَهْلَكَهُ id.</i>	
بَرْتَهُ, v. s. بَرْتَهُ.	
بَرْتَهُ مَهْلَكَهُ μυελός, medulla.	

مُهَوْنَا , ar. مَوْنَز , musa arbor et fructus (gall. banane).

مُهَدَّدَةً , v. s. ۲۱۶ .

مُهَدَّدَةً , v. s. ۲۱۷ .

مُهَدَّدَةً , v. s. ۲۱۸ .

مُهَدَّدٌ, fut. بَعْدَ vacillavit, declinavit, lapsus est. بَعْدٌ جَحْدَه pronus cecidit. بَعْدٌ قَدْهُ eum pes fecerit.

Ethpe. بَعْدَلَلِ id.

بَعْدٌ et بَعْدٌ vacillatio, declinatio, lapsus.

بَعْدَهُ et بَعْدَهُ vacillans; deflectens.

بَعْدَهُ id. q. بَعْدَهُ .

بَعْدَهُ , al. بَعْدَهُ , diversorium, ar. مَوْنَلِ refugium.

بَعْدَهُ et بَعْدَهُ , thos (gall. chacal); cfr. ar. ابن آوى .

بَعْدَهُ id. q. بَعْدَهُ .

بَعْدَهُ بَعْدَهُ , بَعْدَهُ , cfr. ar. بَعْدَهُ , repagulum, vectis.

بَعْدَهُ verb. denom. vecte solidavit.

بَعْدَهُ mercenarius, famulus, v. s. بَعْدَهُ .

بَعْدَهُ vox latina, mulus, mula.

بَعْدَهُ et بَعْدَهُ mula; it. بَعْدَهُ , mola herba; vas æneum.

بَعْدَهُ aliaque deriv. vid. بَعْدَهُ .

بَعْدَهُ بَعْدَهُ , moly, planta fa-

bulosa ; species allii vel ruta sylvestris.

بَعْدَهُ بَعْدَهُ بَعْدَهُ morbus uteri; it. بَعْدَهُ , moly planta.

بَعْدَهُ بَعْدَهُ بَعْدَهُ بَعْدَهُ malva ; corchorus olitorius (gall. mouron).

بَعْدَهُ بَعْدَهُ leno, hermaphroditus, v. s. بَعْدَهُ .

بَعْدَهُ بَعْدَهُ macula, labes; vulnus; cicatrix; trop. culpa, vitium. لَا بَعْدَهُ sine macula, sine labe. لَا بَعْدَهُ كَفَ aliquem infamia notavit.

بَعْدَهُ بَعْدَهُ maculatus; culpatus.

بَعْدَهُ بَعْدَهُ id.

بَعْدَهُ بَعْدَهُ maculatio; لَا بَعْدَهُ كَفَ immunitas a labo.

بَعْدَهُ بَعْدَهُ v. den., culpatus est.

بَعْدَهُ بَعْدَهُ et deriv., v. بَعْدَهُ .

بَعْدَهُ بَعْدَهُ bitumen, unde mumia, ar. مُومِيَة (gall. momie).

بَعْدَهُ , v. s. بَعْدَهُ .

بَعْدَهُ بَعْدَهُ et بَعْدَهُ , pl. بَعْدَهُ بَعْدَهُ et بَعْدَهُ vox lat., moneta; it.

sigillum monetæ; trop. typus, signatio; signum.

بَعْدَهُ بَعْدَهُ et بَعْدَهُ lat., monetarii, eosores argenti.

بَعْدَهُ بَعْدَهُ بَعْدَهُ fera immanis.

بَعْدَهُ بَعْدَهُ بَعْدَهُ بَعْدَهُ بَعْدَهُ , monasterium.

أَحْدَادُ , f. أَحْدَادَهُ calcitro ; it. calceus; atramentum.	Ethpa. اَسْتَهْلِكَنْسَهُ pass.
أَحْدَادُ lat. , mustum.	أَسْتَهْلِكَنْسَهُ superbus, fastuose incedens.
أَحْدَادُهُ calcitrosus.	أَسْبَانْسَهُ subsannatio, irrigatio.
أَحْدَادُهُ مُوْسَيْتُونُ , museum.	أَسْبَانْسَهُ مُوْسَيْتُونُ illusor, subsannator.
أَحْدَادُهُ et أَحْدَادُهُ مُوْسَيْتُونُ , ars musicæ, musica.	أَسْبَانْسَهُ مُوْسَيْتُونُ irrigatio.
أَحْدَادُهُ مُوسِيْتُونُ musicus, cantor.	أَسْبَانْسَهُ مُوْسَيْتُونُ irrigisoni obnoxius.
أَلْوَاهُتَهُ مُوسِيْتُونُ musica.	أَهْلَهُ , pers.-ar. مُوقُ , calceus.
أَمْتَهْلَهُتَهُ ad musicam pertinens.	أَمْتَهْلَهُ , v. s. مُقْبِلٌ .
أَمْتَهْلَهُتَهُ مُوْرَسُوكُسُ , vitulus.	أَفْدَهُهُتَهُ et أَفْدَهُهُتَهُ مُوْرَسُوكُسُ , fungus (gall. champignon).
أَمْتَهْلَهُتَهُ مُوسَيَا , Musa ; sapientia.	أَبْدَلَهُهُ bdellium, ar. مُقْلَلٌ .
أَمْتَهْلَهُتَهُ , pers. نُورُوز , primus anni dies apud Persas ; cfr. نُورُوز .	أَفْدَهُهُ fut. بَعْدَهُ , ar. مَارِ , ad-vexit, spec. frumentum ; comparavit, emit commeatum.
أَمْتَهْلَهُتَهُ , fut. بَعْدَهُ agitavit liquidum, spec. lac ut butyrum fiat ; cfr. ar. مَاءِ .	أَفْدَهُهُ Part. act. بَعْدَهُ .
أَمْتَهْلَهُتَهُ et أَمْتَهْلَهُتَهُ excussio liquoris, concussio lactis ; expressio liquoris.	Ethpe. اَسْتَهْلِكَنْسَهُ pass.
أَمْتَهْلَهُتَهُ , v. s. أَمْتَهْلَهُتَهُ .	Aph. اَسْمَهُتَهُ emere fecit, vendidit, commutavit.
أَمْتَهْلَهُتَهُ , v. s. مُكْفَأٌ .	أَنْتَهُهُ annona, commeatus.
أَمْتَهْلَهُتَهُ et أَمْتَهْلَهُتَهُ magorum præfector, a pers. مُوْتَدَ cultor ignis; it. judex, cfr. ar. مُفْتَى .	أَمْتَهْلَهُتَهُ et أَمْتَهْلَهُتَهُ pl. مَوْرَدَهُ مُوْرَبَا , gradus circuli ; myrrha, μύρρα , ar. مَرَّ .
أَمْتَهْلَهُتَهُ usitat. in partic. مُكْسُهُ , مُسْمَعُ subsannans.	أَمْتَهْلَهُتَهُ v. den., myrrâ condivit.
Pa. أَمْتَهْلَهُتَهُ subsannavit, irrigavit, pler. c. ا pers.	أَمْتَهْلَهُتَهُ مُوْرَبَا unguentum, chrisma ; trop. confirmationis sacramentum.
	أَمْتَهْلَهُتَهُ , ar. مُرَانَ , cornus arbor.
	أَمْتَهْلَهُتَهُ muræna piscis.
	أَمْتَهْلَهُتَهُ et أَمْتَهْلَهُتَهُ baculus, hasta e corno facta.

مَهْوَمْا muria, salsa.
مَهْوَمْا , v. s. مَهْوَمْا .
مَهْوَمْا مَهْوَمْا myrtus.
مَهْوَمْا et مَهْوَمْا مَهْوَمْا myrtinus, ta-
maris; carthamus tinctorius.
مَهْوَمْا et deriv. v. مَهْوَمْا .

لَعْنَهُ, fut. لَعْنَهُ , heb. شَنָׁה ,
ar. مَنْ , contrectavit, palpa-
vit; inde perscrutatus est.

Ethpe. لَعْنَهُ pass.

Aph. أَهْبَتْ palpare fecit.
مَهْمَهْا , it. مَهْمَهْا et مَهْمَهْا at-
trectatio, palpatio; scrutatio.
مَهْمَهْا scrutabilis.
مَهْمَهْا , ar. قَيْسَرْ quercus coccini;
celtis (gall. alizier).
مَهْمَهْا v. s. مَهْمَهْا .

لَأَوْ - raro مَهْ , communius
مَهْ , fut. لَعْنَهُ , imp. لَعْنَهُ , inf.
مَهْ , heb. نَاهَ , ar. مَاتْ , mor-
tuus est; trop. defecit. مَهْ
مَهْ gladio periit. مَهْ مَهْ
مَهْ siti consumptus est. Part.
præs. مَهْ , f. مَهْ ; مَهْ مَهْ
مَهْ dolebat se mor-
riturum. Part. præt. مَهْ , f.
مَهْ , emph. لَعْنَهُ , f. pl.
مَهْ مَهْ حَسْ . مَهْ
مَهْ semimortuus.
Ethpe. مَهْ morte ereptus
est; occisus est.

Pa. لَأَوْ interfecit.
Aph. مَهْ mortem intulit, occi-
dit; trop. mortificavit, do-
muit.
لَهْ m. , ar. مَوْتٌ suff.
مَهْ , مَهْ mors; trop.
calamitas; pl. مَهْ مَهْ genera mortis; supplicia.
مَهْ مَهْ دَهْ وَهْ وَهْ angustiae mortis.
مَهْ مَهْ وَهْ مَهْ mors subita.
مَهْ مَهْ دُهْ دُهْ vel مَهْ مَهْ mors
naturalis. مَهْ مَهْ mors
ab homine sibi concita. مَهْ مَهْ
فَهْ مَهْ diversa mortis seu sup-
plicii genera.
مَهْ مَهْ , pl. مَهْ مَهْ , ar.
pestilentia; strages.
مَهْ مَهْ exitialis, pestiferus.
مَهْ مَهْ , pl. لَعْنَهُ mortalis;
مَهْ مَهْ لَعْنَهُ immortalis,
perpetuus.
مَهْ مَهْ et مَهْ مَهْ mortaliter.
مَهْ مَهْ mortalitas.
مَهْ مَهْ , f. مَهْ مَهْ , it. مَهْ مَهْ ,
مَهْ مَهْ , mortuus.
مَهْ مَهْ mortalitas; mors.
مَهْ مَهْ mortem infligens, leti-
fer. مَهْ مَهْ mortale ve-
nenum.
مَهْ مَهْ , v. s. لَعْنَهُ .
لَعْنَهُ, fut. لَعْنَهُ , ar.
miscuit. مَهْ سَهْ vinum

miscuit seu paravit. *Part.*
pass. مَسْكَنْتُ، مَسْكَنْتَ؛ لَمْ يَمْسِكْ
 non mixtum vinum, merum.
Ethpe لَمْ يَمْسِكْ *pass.*
Pa. مَسْكَنْتُ miscuit, immis-
 cuit; temperavit; *trop.* adul-
 teravit. *Part. pass.* مَسْكَنْتَ؛
 لَمْ يَمْسِكْ؛ لَمْ يَمْسِكْ
 furor effrenatus; *subst.* po-
 tio.
Ethpa. لَمْ يَمْسِكْ *pass.*
 لَمْ يَمْسِكْ et لَمْ يَمْسِكْ، heb. מִזְבֵּחַ, potus
 mixtus; *f.* poculum.
 لَمْ يَمْسِكْ et لَمْ يَمْسِكْ crater,
 poculum.
 مَسْكَنْتُ mixtura.
 مَسْكَنْتُ mixtio.
 مَسْكَنْتُ mixtio, mixtura; tem-
 peramentum corporis, tempe-
 ratio. فَيْلًا حَسْبَ مَسْكَنْتُ male
 constitutum corpus. مَسْكَنْتُ
 فَيْلًا aeris temperies. مَسْكَنْتُ
 وَدَهْدَهْta conjunctio stellarum.
 مَسْكَنْتُ robustus.
 مَسْكَنْتُ mixtim; temperate.
 مَسْكَنْتُ mixtio, temperatio;
 temperies; æquinoctium.
 مَسْكَنْتُ miscens, adulterator.
 مَسْكَنْتُ mixtionis capax.
 مَسْكَنْتُ immixtio.
 مَسْكَنْتُ v. s. ۲۰۱.
 مَسْكَنْتُ funis, *cfr. ar.* سَرْدَهْ *id.*
 مَسْكَنْتُ v. s. ۲۰۱.

virga longa auri argen-
 tive (*gall.* lingot).
 مَسْكَنْتُ medica (*gall.* luzerne).
 مَسْكَنْتُ cibus, *v. s.* ۲۰۱.
 مَسْكَنْتُ mos, natura, *cfr. ar.* *id.*
 مَسْكَنْتُ مَسْكَنْتُ malleus; *cfr.* لَوْهَهْ مَسْكَنْتُ
 مَسْكَنْتُ pediculus foliorum palmæ
 e quibus corbes conficiuntur;
cfr. μίσγος folii pediculus.
 مَسْكَنْتُ صَدَّافَةً، fut. نَعْصَهْ، insedit
 jumento; *it.* pandiculatus est;
cfr. مَسْكَنْتُ distendit.
Ethpe لَمْ يَمْسِكْ et *Ethpa.* لَمْ يَمْسِكْ
 pandiculatus est.
 مَسْكَنْتُ مَسْكَنْتُ et مَسْكَنْتُ instrumentum
 torturæ quo crura *vel* humeri
 constringuntur; compedes.
 مَسْكَنْتُ robustus, pinguis.
 مَسْكَنْتُ pandiculatio.
 مَسْكَنْتُ et لَوْهَهْ مَسْكَنْتُ malleus, clava.
 مَسْكَنْتُ sycomorus.
 مَسْكَنْتُ pera; *cfr.* مَسْكَنْتُ، *s.* ۲۰۱.
 مَسْكَنْتُ chald. مَسْكَنْتُ, filius adul-
 terinus.
 مَسْكَنْتُ f., pl. مَسْكَنْتُ pilus, *cfr.*
 مَسْكَنْتُ *id.*
 مَسْكَنْتُ صَحْفَةً، heb. صَحْفَةً، fut. نَعْصَهْ،
 inf. مَسْكَنْتُ, verberavit, per-
 cussit; cecidit; infixit tento-
 rium; *c. vel s.* حَسْنَةً وَعِدَةً induit
 vestes; irruit, invasit, pler.

<i>c.</i> حَلَ vel حَلَ . Part. act. مَسْنَا ,	مسنا verberator.
مَسْنَا pro إِنْ مَسْنَا ; مَسْنَا verbero. Part. pass. مَسْنَا ;	مسنا et مَسْنَا percussio violenta.
مَسْنَا bellum conse- ruit c. aliquo. مَسْنَا حَلَ حَلَ	مسنا plagis affectus, vul- neratus.
مَسْنَا لَأْوَحَى in genua procidit. مَسْنَا	مسنا clades.
مَسْنَا eum clavis affixit. مَسْنَا	مسنا v. s. .
مَسْنَا egit radices planta. مَسْنَا قَفَّا	مسنا balaustion ; margo pu- tei; cfr. سُه circumdedit.
مَسْنَا composit manus. مَسْنَا تَفْعِيْه حَسَافَا	مسنا etc., v. s. .
مَسْنَا se projecit cum impetu. مَسْنَا حَتَّى بُرُوا	مسنا statim, v. s. .
manus cum aliquo conser- erunt. مَسْنَا كَمْيَة اْرْبَعَة	مسنا v. s. .
urbem in- vasit. مَسْنَا حَسْنَة حَسْنَة	مسنا , al. مَسْنَا , amans, ama- sius.
lum- bos cilicio cinxit. مَسْنَا حَلَ حَلَ	مسنا f. مَسْنَا ئَمْدَا id.
مَهْفَع nummos in alicujus nomine cudit.	✓
<i>Ethpe.</i> مَهْسَبْل percussus est ; verberatus est.	مسب fut. مَهْسَبْل odoratus est. Part. passs. مَهْسَبْل put- tressens ; cfr. ar. حَلَ detrita est vestis.
<i>Pa.</i> مَهْسَبْل violenter verberavit, vulneravit. Part. pass. مَهْسَبْل , مَهْسَبْل .	مسب in pulverem redactus est.
<i>Ethpa.</i> مَهْسَبْل pass.	مسب volutatus est.
<i>Aph.</i> مَهْسَبْل percutere fecit.	مسب luteum ovi, heb. حَلَ et ar. حَلَ ; medulla, cerebrum ; trop. ingenium, ar. حَلَ .
أَهْسَبْل وَسْ مَهْسَبْل دَافَتْهُ ascendere feci seu excitavi odorem putredinis vestrae ad nares vestras.	مسب cerebralis.
مسنا et مَسْنَا , pl. مَسْنَا ,	مسن , ar. مَخَاط , mucus.
ictus, vulnus; afflictio, plaga, pugna, strages ; flagellum.	مسن mucosus.
مسنا et مَسْنَا بِمَنْلَا correptiones.	مسنا cognatio, v. s. .
مسنا percussio, ictus.	مسن , v. s. .
	مسن et مَسْنَا مَسْنَا , v. s. .

debilis, fut. **لَعْنَتُ**, debilis fuit; cfr. ar. مَجْلِي sterilis fuit annus. Part. pass. **لَعْنَتُ**, مَهْمَلٌ; pro adj. usurp. debilis, infirmus; pauper, humilis, vilis. حَمَّدَهُ لَعْنَتُ parum instructus.

Ethpe. **لَعْنَتِي** debilis fuit.

Pa. **لَعْنَت** debilitavit.

Ethpa. **لَعْنَتِي** pass; c. **لَعْنَتُ** impar fuit operi.

Aph. **لَعْنَتِي** debilitavit; infirmus factus est.

لَعْنَةً debilitas, parvitas, paucitas, defectus, pl. **لَعْنَاتٍ**; **لَعْنَةً** prout fert mea tenuitas.

لَعْنَةً debilitatio.

لَعْنَةً debilitationi obnoxius; **لَعْنَةً** invictus.

لَعْنَمَ geometra, mensurator. Pa. **لَعْنَمَ** v. denom., dimensus est.

لَعْنَمَ geometria, mensuratio.

لَعْنَمَ et لَعْنَمَ, heb. בְּהָרֶב, eras; postea, in posterum. **لَعْنَمَ et لَعْنَمَ**

لَعْنَمَ, it. حَكْمَسْنَا et حَكْمَسْنَا vel **لَعْنَمَ** die postero; cfr. אַחֲרָה posterior fuit et אַחֲרָה in posterum.

لَعْنَمَ infin. verbi **لَعْنَمَ**.

لَعْنَهُ, cfr. heb. נִזְבֵּן, ar. مَخْفِي, ivit, petiit locum; obtigit, contigit; c. **لَعْنَهُ** supervenit; absol. vel saepius seq. حَامِتْهُ بِعِنْدِهِ لَعْنَهُ pervenit ad eum nuntius. لَعْنَهُ اَنْدَهُ اِلَوْنَهُ haereditas ei advenit.

لَعْنَهُ مَنْ تَعْدِي quid tibi prodest?

Part. act. **لَعْنَهُ**, **لَعْنَهُ**; بِعِنْدِهِ لَعْنَهُ حَامِتْهُ لَعْنَهُ potuit. لَعْنَهُ اَنْوَى حَامِتْهُ potui.

Ethpe. **لَعْنَهُ** pervenit.

Pa. **لَعْنَهُ** adduxit, perduxit; it. advenit, attigit. لَعْنَهُ حَامِتْهُ اِلَهَهُ in eo fuit ut caderet.

Ethpa. **لَعْنَهُ** perductus est, pervenit.

Aph. **لَعْنَهُ** adduxit.

لَعْنَهُ, **لَعْنَهُ** adventus.

لَعْنَهُ, **لَعْنَهُ** et **لَعْنَهُ** portio; pars obtenta; accessus.

لَعْنَهُ accessus; assecutio, prosecutio.

لَعْنَهُ pervius, assecutione possibilis.

لَعْنَهُ aditus, prosecutionis facultas.

لَعْنَهُ, **لَعْنَهُ** et **لَعْنَهُ** μετάνοια, penitentia, spec. exterior, uti inclinationes, prostrationes, etc.; cfr. supra.

لَعْنَهُ.

סְדָה, ar. سَدَّ, fut. سَدَعَ, linxit.

Ethpe. سَدَلٌ pass.

Pa. سَدَّ avide linxit.

Aph. سَدَّ lingere fecit.

سَدَّا et سَدَّا linctus, actus lingendi.

سَدَّا id quod lingitur.

سَدَّا lambens; f. سَدَّا index digitus.

سَدَّا ut سَدَّا .

سَدَّا et سَدَّا ob, propter; quoad, pro; it. de, ut سَدَّا ; st. const. pl. cum suff. سَدَّا propter me. سَدَّا propter nos. سَدَّا سَدَّا propter eum. سَدَّا سَدَّا propter hoc; سَدَّا سَدَّا id.; سَدَّا سَدَّا hac de re. سَدَّا سَدَّا tractatus de Fide. سَدَّا سَدَّا quare? ; seq. ? prop terea quod, quia, quum, ut, eo fine ut; سَدَّا سَدَّا propterea quod non, ne; سَدَّا سَدَّا quare? سَدَّا سَدَّا ex odio. ... , سَدَّا سَدَّا hæc omnia ad id tendunt ut; cfr. targ. סְדָה et talm. סְדָה id.; sec. aliquos a rad. سَدَّا one re gravavit.

سَدَّا , v. s. سَدَّا .

سَدَّا et سَدَّا etc., v. s. سَدَّا .

سَهْكَمْ et سَهْكَمْ , pl. سَهْكَمْ et سَهْكَمْ مَهْتَلَلَهْ مَهْتَلَلَهْ μέταλλον, fodina; insula.

سَهْكَمْ سَهْكَمْ metallicus; subst. سَهْكَمْ سَهْكَمْ fodinæ.

سَهْكَمْ malva.

سَهْكَمْ stilla, v. سَهْكَمْ .

سَهْكَمْ , fut. سَهْكَمْ pluit.

Ethpe. سَهْكَمْ id. ; pluvia irrigatus est campus.

Pa. سَهْكَمْ pluviam induxit, pluviam effudit.

Aph. سَهْكَمْ id. ; impers. لِسَهْكَمْ , fut. سَهْكَمْ pluit; trop. liberatiter impertitus est.

Ethtaph. سَهْكَمْ ut pluvia descendit; pluvia inundatus est.

سَهْكَمْ et سَهْكَمْ ut سَهْكَمْ .

سَهْكَمْ pluviosa tempestas.

سَهْكَمْ ar. سَهْكَمْ , pluvia; it. solea, calceus.

سَهْكَمْ pluvia.

سَهْكَمْ et سَهْكَمْ pluviosus.

سَهْكَمْ et سَهْكَمْ مَهْتَلَلَهْ actio pluviam immittendi.

سَهْكَمْ qui pluviam immittit.

سَهْكَمْ بَرِّخَة , matrix, uterus.

سَهْكَمْ et سَهْكَمْ , inde ar. سَهْكَمْ , metropolita.

سَهْكَمْ v. denom., metropolita factus est.

مَدْ مَدْ فَهْكَمْ vel مَدْ فَهْكَمْ metropolis.

مَدْ مَدْ فَهْكَمْ cujus forma abbrev. est مَدْ metropolita.

مَدْ فَهْكَمْ et مَدْ فَهْكَمْ metropolitae dignitas.

مَدْ فَهْكَمْ v. denom., metropolitanus factus est.

مَدْ, semper in pl., abs.

مَدْ , heb. מְרֻבָּה , ar. مَدْ , aqua, aquæ ; succus ; albu-

men ovi ; st. c. مَدْ , c. aff. مَدْ vel مَدْ aquæ meæ,

بَرْقَةٌ vel بَرْقَةٌ aquæ ejus, مَدْ aquæ eorum, etc.

مَدْ مَدْ مَدْ balneum. مَدْ مَدْ مَدْ albumen ovi. مَدْ مَدْ مَدْ vel مَدْ succus uvarum

immaturarum. مَدْ مَدْ مَدْ vel مَدْ aquæ furtivæ :

adulterium. مَدْ مَدْ مَدْ aquæ extraneæ : id. مَدْ مَدْ مَدْ hydromel. مَدْ مَدْ aquæ falsæ : animi abreptio in cu-

piditates. مَدْ مَدْ مَدْ vel مَدْ atramentum.

مَدْ مَدْ مَدْ fluxus menstrualis. مَدْ مَدْ مَدْ fæx, amur-

ca. مَدْ مَدْ aquæ mendaces : species falsa aquarum in de-

serto (gall. mirage). مَدْ مَدْ

مَتْ فَهْكَمْ urina. فَنْ urina. lixi-
via. مَتْ فَلْ depositio alvi,

urina. et مَتْ وَهْكَمْ aquæ irrigationi adhibitæ.

مَدْ مَدْ مَدْ aquosus.

مَدْ مَدْ مَدْ aquaticus ; cfr. مَدْ مَدْ مَدْ supra.

مَدْ مَدْ مَدْ et مَدْ مَدْ aquositas.

مَدْ مَدْ , pers.-ar. مَدْ , hippo-
dromus.

مَدْ مَدْ millarium (gall. parasan-
ge).

مَدْ مَدْ مَدْ μηδίον , medica herba.

مَدْ مَدْ aurifaber ; cfr. ar. مَدْ مَدْ مَدْ aqua regalis.

مَدْ مَدْ ex græc. med. ævi μάγιστρος , magister.

مَدْ مَدْ مَدْ , v. s. مَدْ .

مَدْ مَدْ pars demensa terri-
torii.

مَدْ مَدْ mansio.

مَدْ مَدْ مَدْ μέταξ , sericum.

مَدْ مَدْ مَدْ , v. s. مَدْ .

مَدْ مَدْ مَدْ , v. s. مَدْ .

مَدْ مَدْ مَدْ , pl. μίλιον , c. , milliare, mille passus ; it.

μῆλον poma. مَدْ مَدْ مَدْ cydonium (gall. coing).

مَدْ مَدْ مَدْ μηλιτum. tapetum. pl. مَدْ مَدْ مَدْ . cfr. مَدْ مَدْ مَدْ .

مَدْ مَدْ مَدْ , v. s. مَدْ .

مُعْدَن typus, matrix, spec.
æris fundendi; cfr. مُهَاجِر.

مُعَدِّل, ambidexter, a **معَادِل**.

مُنْهَمْهَمْ, **مُنْهَمْهَمْ**, pl. **مُنْهَمْهَمْ**
 minus; homo infamis,
 vilis; nebulo, adulter.

أَنْفَخَهُمْ et مَنْفَخَهُمْ ars mimi ;
trop. adulterium, mores ef-
feminati.

מֵת, **מַתָּא**, *heb.* מִנְ, genus,
gens, tribus.

μηναῖον, meneum seu
sanctorum acta pro quolibet
mense disposita.

مِمْبَرٌ μῆμνιγς, membrana cerebri.

مَهْنَدٌ et مَهْنَدٌ, it. مَهْنَدٌ μίνθη,
mentha.

μίτρον, vitriolum.

paropsis, catinus.

musicus, *v. s.*

psaltes, ut **مَدْحُومٌ** .
أَلْوَانٌ **مَدْحُومٌ** ars musicæ.
أَنْجُونٌ ut **مَدْحُومٌ**

مِسْكَمَةٌ indigofera tinctoria herba.

papaver.

χριστός μέρον, unguentum,
chrisma.

مَحْمَعًا *quercus coccifera, celtis,*
ar. قَمِيسٌ; *talus quo cum lu-*
dunt pueri; it. uvæ passæ
(ar. زَبَبٌ).

مُخْتَلِفٌ, contr. ex مُخْتَلِفٌ et مُخْتَلِفٌ, abhinc; exinde. مُخْتَلِفٌ . . .

مُنْهَىٰ hinc... et illinc. **مُنْهَىٰ**

﴿مُنْهَى﴾ ex hoc deinceps. ﴿مُنْهَى﴾ abhinc. حَمِيدًا مُنْهَى intra annum.

مَحَا part. Aph. verbi **مَحَا**.

مَدِّ, fut. **مَدَّ** et **مَدِّ**,

heb. ־ְנַעֲמָה, *depressus est, stratus est; it.* stravit, se stravit, prostratus est; descendit, *trop.* viluit; *c.* נִעְמָה minor factus est, inferus fuit. **לְנִעְמָה**

مَدْعُوٌّ sibi stravit cinerem.
Part. præs. et act. **مَدْعُودًا**,

et مُحَافِدًا, pl. *مُحَافِداتٍ*, f. *مُحَافِدَةً* ; *emph.* *مُحَافِدًا* et *مُحَافِدَةً* ; *adj.*

humilis, vilis ; plebeius ; minor, *in f. emph.* viliora, resiliens, &c., ² infusor. Part.

villares; c. 20, inferior. A

Ethope, *أَثْوَابٌ* stratus est.

Pa. مَهْ depressit; prostravit;
humiliavit; *c.* — deiecit;

rem. Part. pass. مَهْمَدْخَى , مَهْمَدْخَى ; adj. humiliis.	jam, postea ; statim, mox, nunc ; igitur, nunc vero. مَهْلَكَى quoniam ; postquam ; cfr. مَهْلَكَى .
Ethpa. مَهْمَدْخَى pass. et refl. ; se demisit, semetipsum humiliavit. تَهْمَدَهُ أَنْهَى امْهَدَهُ تَهْمَدَهُ totus orbis suo imperio se subjecit ; it. ut Ethpe.	مَهْلَكَى part. Aph. tum rad. مَهْلَكَى , tum rad. مَهْلَكَى .
Aph. مَهْلَكَى depressit, prostravit, humiliavit. Part. pass. مَهْمَدْخَى ; stratus. تَهْمَدَهُ حَمْدَهُ caput demisit.	مَهْلَكَى vectis ; v. supra s. مَهْلَكَى .
مَهْلَكَى demissio, prostratio; stratum.	مَهْلَكَى inf. v. مَهْلَكَى .
مَهْلَكَى , nnq. مَهْلَكَى مَهْلَكَى humilitas ; prostratio dormientis ; margo putei ; uter natatorius.	مَهْلَكَى μηγγανή , machina, pl. مَهْلَكَى ; مَهْلَكَى .
مَهْلَكَى actus sternendi.	مَهْلَكَى regiones.
مَهْلَكَى morsus, v. s. مَهْلَكَى ; it. v. s. مَهْلَكَى .	مَهْلَكَى μηγγανήμαχτα , machine bellicæ.
مَهْلَكَى , ar. pers. مَكْوَكَى , mensurae nomen.	مَهْلَكَى et مَهْلَكَى μηγγανήος , mechanicus.
مَهْلَكَى depressus, humiliis; vilis.	مَهْلَكَى v. s. Aph. rad. مَهْلَكَى .
مَهْلَكَى مَهْلَكَى humiliis spiritu.	مَهْلَكَى inf. v. مَهْلَكَى .
مَهْلَكَى et مَهْلَكَى humiliiter, de-	مَهْلَكَى pl. مَهْلَكَى vectigal, tribu-
missae ; submissae.	tum ; cfr. heb. מַכְנָה , ar. مَكْنَس id.
مَهْلَكَى مَهْلَكَى humilias. مَهْلَكَى animi demissio.	مَهْلَكَى infin. verbi مَهْلَكَى .
مَهْلَكَى humiliatio.	مَهْلَكَى publicanus, tributo-rum collector. حَمْدَهُ مَهْلَكَى te-lonium.
مَهْلَكَى et مَهْلَكَى humiliator.	مَهْلَكَى publicani munus.
مَهْلَكَى et alia deriv., v. s. مَهْلَكَى .	مَهْلَكَى v. denom., tributum solvit.
مَهْلَكَى , contr. ex مَهْلَكَى et مَهْلَكَى , adv. temp. : ex hoc tempore ;	مَهْلَكَى , fut. نَعْلَمَهُ , mercatus

est, emit, *spec. de sponsa*; *inde desponsavit sibi vel alteri, c. ۷*; fidit terram ut aquas in eam immitteret, *id. q. ar.* مَخْرَجٌ. *Part. pass.* مَهْكَنٌ, f. *emph.* مَهْكَنًا; *subst.* sponsa.

Ethpe. مَهْكَنًا *pass.*, desponsata est mulier; irrigata est terra.

Pa. مَهْكَنٌ despondit.

Ethpa. مَهْكَنًا *pass.*

Aph. مَهْكَنٌ desponsavit.

Ettaph. مَهْكَنًا *pass.*

مَهْكَنًا desponsatio. مَهْكَنًا *ca-* *vitas*, fissura terræ.

مَهْكَنًا sponsalia, desponsatio.

مَهْكَنًا sponsalia.

مَهْكَنًا sponsus; sponsor; *malo sensu*, prostituens filios aut filias.

مَكَارٌ famulus, *ar.* كَرَى locavit.

مَهْكَنًا desponsatio; affinitas.

مَهْكَنًا et مَهْكَنًا lagena, urceus ore angustus.

مَهْكَنًا, al. مَفَرَّةٌ, *ar.* مَهْكَنًا. minium; lagena.

مَهْكَنًا minium; *it.* fascis, *v. s.* دَهْنًا.

مَهْكَنًا desponsator.

مَهْكَنًا nubilis.

مَهْكَنٌ, *heb.* نَهَلَ, *ar.* مَهْكَنٌ, *fut.*

نُهَلَانٌ, *inf.* مَهْكَنٌ, implevit, repelvit; resarcivit restes; sufficit, satis fuit; impletus est, completus est; مَهْكَنٌ مَهْكَنٌ manus suas Domini servitio consecravit; مَهْكَنٌ مَهْكَنٌ instruxit manum suam arcu; *abs.* intendit arcum. مَهْكَنٌ consolatus est eum. مَهْكَنٌ مَهْكَنٌ ore pleno locutus est. مَهْكَنٌ مَهْكَنٌ explevit oculum: avide respexit. مَهْكَنٌ مَهْكَنٌ implete hydrias aqua. *Part. act.* مَهْكَنٌ, مَهْكَنٌ, implens, etc. *Part. pass.* مَهْكَنٌ, مَهْكَنٌ, f. *emph.* مَهْكَنٌ, pl. m. مَهْكَنٌ, *emph.* مَهْكَنٌ, f. مَهْكَنٌ, *emph.* مَهْكَنٌ, plenus. مَهْكَنٌ مَهْكَنٌ arcus tensus. مَهْكَنٌ مَهْكَنٌ plena gratiâ; مَهْكَنٌ مَهْكَنٌ plena gratiâ; مَهْكَنٌ مَهْكَنٌ plena erat dolo; *ad modum substantivi* construitur cum nominibus, spatii vel temporis præsertim, ad plenitudinem designandam: مَهْكَنٌ مَهْكَنٌ quod occupat tempus: temporarius. مَهْكَنٌ مَهْكَنٌ ad tempus. مَهْكَنٌ مَهْكَنٌ vel quod implet pugillum: quantum continet pugillus. مَهْكَنٌ مَهْكَنٌ id. مَهْكَنٌ مَهْكَنٌ quod implet vires: summis viribus. مَهْكَنٌ مَهْكَنٌ vel quod occupat manum: quan-

tum continet manus ; (*cfr. ar.* مَلَّا مَهْدًا *id.*). محلُهُ مَهْدًا durans unum diem, spatium diei. *quod totum tenet :* universus orbis. مَلَّا خُبُرًا breve tempus, aliquantisper. مَلَّا حَتَّى *id.* مَلَّا حَتَّى *in ictu oculi* : puncto temporis. مَلَّا قَدْمًا *quod os implet* : bucca, buccea. محلُهُ مَهْدًا *vel* محلُهُ مَهْدًا spatium horæ, ad horam.

Ethpe. اِحْمَكْ pass. اِحْمَكْ دَخْنَةً animo corroboratus est; اِحْمَكْ حَسْدٌ مَعْدَداً مَعْدَداً et impletum est convivium dis- cumbentibus.

Pa. مَكَّ implevit, complevit; explevit, perfecit; sufficit; مَكَّ كَعْدَفَةً idolis sacrificavit. مَكَّ وَهَدَ أَحْمَدَ locum ex- plevit patris; مَكَّ مَهْدَداً opitulatus est necessitatibus eorum. Part. act. مَهْدَداً, مَهْدَداً. Part. pass. مَهْدَكْ مَهْدَداً; adj. obnoxius.

Ethpa. اِحْمَكْ pass.

Aph. اِحْمَكْ implevit. Part. act. مَهْدَلاً دَخْنَةً ; مَهْدَلاً consolatio.

Schap. مَعْدَكْ complevit, perfecit, consummavit; ad finem perduxit; explevit, absolvit *rem*; celebravit *festum, sacra*; c. ؛ مَهْدَدَ obedivit, sc-

cutus est; seq. بِـ conse- cravit vel confirmavit *episco- pum*, ordinavit *presbyterum*. مَعْدَكْ حَمْدَهُ هَيْهَا annum cum ipso peregit. مَعْدَكْ فَهْوَهُ مَعْدَكْ prae- dicationem instituit. Part. act. مَهْدَلاً, مَهْدَلاً, perficiens; it. desinens. Part. pass. مَهْدَلاً, مَهْدَلاً, f. emph. مَهْدَداً; adj. perfectus, in- teger; adultus. مَهْدَداً مَهْدَداً gramm. nomen zekopho desi- nens.

Ettaph. اِحْمَكْ pass.; satis- factus est; sacerdotii pleni- tudinem accepit; confirma- tionem *episcopalem* habuit; trop. martyrium consumma- vit.

مَكْلَمًا et مَلَّامًا plenitudo.

مَكْلَمًا *id.*

مَكْلَمًا fascia.

مَكْلَمًا et مَلَّامًا مَلَّامًا et مَلَّامًا inundatio; fluxus aquarum.; nnq. plenitudo, ut مَكْلَمًا .

مَكْلَمًا , rectius مَكْلَمًا et مَكْلَمًا , pl. مَكَّاتٍ مَكَّاتٍ summa, plenitudo; materies; massa, copia pecuniae, suppel- lex; materia *Sacramenti*; ar- gumentum sermonis; occasio; humores. مَكْلَمًا قَنْقَنًا subsi- dium cor porale seu divitiae.

- مَكْنَمًا implens ; resarciens.
- مَكْنَمًا aquarium, lagena ; pirus, pl. مَكْنَمًا.
- مَكْنَمًا plene ; integre, perfecte.
- مَكْنَمًا plenitudo, abundantia.
- مَكْنَمًا complementum.
- مَكْنَمًا مَكْنَمًا, مَكْنَمًا completio, explicatio ; plenitudo, pars integra ; حُمَّهُكُمْنَا وَمَنْتَا quando complebuntur anni. مَكْنَمَةُ وَحْيًا Ecclesiæ universalitas.
- مَكْنَمًا sartor.
- مَلَأْ forma minus recta pro مَلَأْ , plenus ; it. partic. sicut لَأْ , et ar. مَلَأْ , si non, nisi ; tunc ; it. part. Aph. v. لَأْ .
- مَلَأْ مَلَأْ , malus arbor et fructus ; oleum.
- مَلَأْ et مَكْنَمًا colostrum.
- مَلَأْ , v. s. لَأْ .
- مَكْنَمًا مَكْنَمًا , مَكْنَمًا complemen- tum, consummatio ; integritas ; trop. mors ; Officium ecclæsiasticum ; id quod perficit, inde consecratio, ordinatio sacerdotum ; gramm. terminatio. مَكْنَمًا وَقَانِيَا mysteriorum celebratio. مَكْنَمًا وَقَانِيَا maturitas fructuum. مَكْنَمًا مَكْنَمًا caro consecrata.
- مَكْنَمًا et مَكْنَمًا ad perfectionem rei spectans.
- مَكْنَمًا implens, explens ; perficiens.
- مَكْنَمًا et مَكْنَمًا plene, integre.
- لَأْ مَكْنَمًا perfectio ; imperfectio. لَفَمَا مَكْنَمًا secundum perfectionem : absolute, omnino, ad unguem.
- مَكْنَمًا perficiens ; ad perfectionem attinens ; ad consecrationem spectans.
- مَكْنَمًا perfectio, completio.
- مَكْنَمًا مَكْنَمًا integre, perfecte.
- مَكْنَمًا perficiendus, inde cætachumenus, ordinandus.
- مَكْنَمًا perfectio, consecratio.
- مَلَأْ , v. s. لَأْ .
- مَلَأْ مَلَأْ , مَلَأْ مَلَأْ , mollusca seu mollia animalia.
- مَكْنَمًا crocus ; unguentum, pers-ar. مَلَبْ id.
- مَدْلَأ**, heb. מַלְאָה , fut. מַלְאֵה et مَكْنَمًا , fricuit ; evulsit, depilavit. Part. pass. مَكْنَمًا , مَكْنَمًا eradicatus, divulsus, dilaceratus.
- Ethpe. مَكْنَمًا pass.
- مَكْنَمًا depilatio, evulsio pennarum ; ipsæ pennæ ; spicæ divulsæ.
- مَكْنَمًا et مَكْنَمًا evulsor.

مَدْلُونٌ lingua, *a rad.* لِنْجَةٌ.

مَدْلُونٌ μάλαγμα, malagma, medicamentum emollientis; emplastrum; ligatura, vinctura vulneris; *pl.* مَدْلُونٌ, مَدْلُونٌ.

مَالَكْمُ, مَالَكْمُ, مَالَكْمُ, مَالَكْمُ, مَالَكْمُ et مَالَكْمُ, μᾶλλον, magis, potius, a fortiori. ; seq. مَالَكْمُ quin imo; مَالَكْمُ quanto magis. أَيْ مَالَكْمُ حِلْخَاتٌ هَهُاهُاتٌ magis quam aurum et argentum.

مَدْلُونٌ, fut. نَعْلَمْ, ar. مَلَأَ, heb. צָלַחַ, sallivit, salem adspersit rei, conspersit; it. salsus fuit. Part. act. مُنْكَسٌ, مَدْلُونٌ, f. emph. مَدْلُونٌ; it. sal-sus, salsa; مَدْلُونٌ locus, salsus, seu sterilis. Part. pass. مَدْلُونٌ, مَدْلُونٌ salitus; salsus. Ethpe. مَدْلُونٌ pass. et refl.; c. حَمْلٌ pers., manducavit apud aliq. ut hospes.

Pa. مَدْلُونٌ sale condivit cibum; it. den. a مَدْلُونٌ, gubernavit.

Ethpa. مَدْلُونٌ pass.; it. salem c. aliquo sumpsit hospitum more; navigavit.

Pa. مَدْلُونٌ f., ar. مَنْجَةٌ, sal; مَدْلُونٌ sal foederis; trop. foedus pacis. مَدْلُونٌ آمَدَّا فَمَهْ

ammoniacum. تَمْلَأْتٌ sal minerale.

مَدْلُونٌ, pl. مَدْلُونٌ locus sal-suginosus; salina; palus.

مَدْلُونٌ plantæ salsaæ species, ar. مَلَاحٌ.

مَدْلُونٌ, ar. مَلَاحٌ, nauta; trop. rector, gubernator.

مَدْلُونٌ ars nautica; gubernatio navis, ar. مَلَاحَةٌ; it. salina, salsugo, ar. مَلَاحَةٌ.

مَدْلُونٌ salsa; gubernatus, مَدْلُونٌ salsa.

مَدْلُونٌ salsedo.

مَدْلُونٌ sale adspersus; trop. sapidus, sapiens; it. navigabilis. نَبْعَدْلُونٌ, even-tus fortuitus.

مَدْلُونٌ gubernatio.

مَدْلُونٌ, fut. نَعْلَمْ, ar. مَنْطَلَقٌ, luto illevit; trop. induit; it. curavit, studium adhibuit, c. ح. Part. act. مُكْرِهٌ; se immiscens; peritus, prudens. Part. pass. مَدْلُونٌ; instruc-tus, exercitatus, peritus.

Ethpe. مَدْلُونٌ pass.

Pa. مَدْلُونٌ luto illevit.

Ethpa. مَدْلُونٌ pass.

مَدْلُونٌ lutum, cæmentum, heb. طَلَقٌ, ar. مَلَاطٌ; apum propo-lis; studium, cfr. μελέτη.

مَكْتُومٌ perite.

مَكْتُومًا peritia, ingenium.

مَكْتُومًا calce vel luto linie-
dus vel linitus.

مَكْتُومًا μάλιστα, præsertim,
maxime, imprimis.

مَكْتُومًا μελίκρατον, hydro-
mel, mulsum.

مَكْتُومًا, gr. med. οῖνος, μιλιάριον,
lebes, pultarius (gall. bouil-
loire); it. mellarium, alveare.

مَلْخَى, fut. تُعْكِمَهُ consi-
liatus est, suasit; indicavit,
proposit; promisit, pollici-
tus est. Part. act. مَكْتُوبٌ,
مَلْخَى; subst. consiliarius, f.
emph. مَلْخَى consiliaria.
Part. pass. مَكْتُوبٌ, مَكْتُوبٌ pro-
missus, propositus. مَلْخَى مَكْتُوبٌ
antea promissus
fuerat.

Ethpe. مَكْتُوبٌ promissus est;
consilium cepit.

Pa. مَكْتُوبٌ consilia dedit; pro-
misit; regem creavit.

Ethpa. مَكْتُوبٌ pass.; consilium
iniit, consuluit; consilia at-
tulit; consiliis paruit. مَلْخَى
مَلْخَى مَلْخَى consili-
lum adhibeas et tunc agas.

Aph. مَكْتُوبٌ regnavit; præfuit
muneri; dominatus est, inva-

sit, c. مَلِكٌ; regnare fecit; con-
silia dedit.

Ettaph. مَكْتُوبٌ rex creatus
est; cum مَلِكٌ, ab aliquo subju-
gatus est.

مَهْدَحَةٌ promissio; consilium;
regnum, dominium, ar. مَنْكَرٌ.
مَلْخَى vel مَلْخَى, heb. מֶלֶךְ,
ar. مَلِكٌ, pl. مَلَكَاتٌ مَلَكَاتٌ
st. c. pl. مَلَكَاتٌ rex, princeps,
imperator; chalifa; fermentum
eucharisticum; c. suff.
1st pers. مَلَكٌ, مَلَكٌ, pl.
مَلَكَاتٌ; 2nd pers. مَلَكٌ, pl.
مَلَكَاتٌ, f. مَلَكَاتٌ; 3rd pers.
مَلَكَاتٌ, f. مَلَكَاتٌ rex meus,
tuus, . . reges mei etc.

مَلَكَةٌ dim., f. مَلَكَةٌ, re-
gulus; it. basiliscus serpens.

مَلَكَةٌ, st. c. مَلَكَاتٌ, pl. مَلَكَاتٌ
مَلَكَاتٌ, princeps femina;
regina, imperatrix. c. suff.
1st pers. مَلَكَاتٌ, مَلَكَاتٌ,
regina mea, nostra; etc., 2nd
pers. مَلَكَاتٌ, 3rd pers. مَلَكَاتٌ, etc.
مَلَكَاتٌ regie.

مَلَكَاتٌ vel مَلْخَى consilium.
مَلَكَاتٌ vel مَلْخَى حَسْنَةٌ مَلَكَاتٌ
consiliarius, pl. مَلَكَاتٌ حَسْنَةٌ
consiliarii ejus.

مَكْتُومًا consiliarius.

مَكْتُومًا consilium.

مَكْتُومًا prudenter.

مُكْتَبٌ suasorius.

مَلْحَقٌ , مَلْحَقًا , pl. مَلْحَقٌ , مَلْحَقًا regnum ; majestas, dignitas, *titulus honorificus* : مَلْحَقٌ majestas tua : o Rex (gall. Votre Majesté), مَلْحَقٌ مَلْحَقًا مَلْحَقًا civitas regia. حَدَّثَهُ مَلْحَقٌ مَلْحَقًا in variis imperiis.

مَلْحَقٌ regius ; pl. f. مَلْحَقٌ regia facinora vel negotia. مَلْحَقٌ regia dignitas.

مَمْكُرٌ , ar. مَمْلُوكٌ , servus; (*unde gall. Mameluk*).

مَهْمَدَخْتَارٌ ad consilium pertinens ; suadendus.

مَهْمَدَخْتَارٌ consultatio.

مَكْهَصٌ f., μαλάχη, ar. مُلُوخَيَةٌ , malva.

مَكْهَدٌ et مَلَاقِتٌ id.

﴿ حَدَّثَنَا usit. in Part. pass., v. infra.

Pa. ﴿ مُكْتَبٌ locutus est, dixit ; sonuit cithara ; disseruit cum aliq.; cfr. heb. בְּלָבֵד ; مَكْهَصٌ locutus est cum eo iudicium : damnavit eum. ﴿ مَكْهَصٌ calicem consecravit.

Part. act. ﴿ مَكْتَبٌ ; مَكْتَبٌ de divinis tractans, theologus. مَكْتَبٌ فَهْدَخْتَارٌ astrologi. مَكْتَبٌ قَاتِلٌ قَاتِلٌ

مَكْتَبٌ فَتَّيَةٌ hierophantes.

vel حَدَّثَنَا physiologus.

مَكْتَبٌ حَدَّثَنَا ventriloqui.

Ethpa. ﴿ مَكْتَبٌ pass. dictus est ; habitus est sermo *inter*, seq. حَدَّثَ pers. ; accusatus est ; it. ut Pa.-Part. pass. لَمْ يَمْكُلْ ineffabilis.

مَكْلَأٌ مَكْلَأٌ f., st. c. مَكْلَأٌ , pl.

مَكْتَبٌ مَكْتَبٌ , st. c. مَكْتَبٌ , verbum, dictum, mentio ; sermo, oratio ; edictum, mandatum ;

per extens. res, id. q. heb.

רֶבֶד ratio, causa ; cura ;

مَكْلَأٌ مَكْلَأٌ مَكْلَأٌ doxologia.

مَكْلَأٌ مَكْلَأٌ مَكْلَأٌ promisit ; res-

pondit. بَعْثَتْ مَكْلَأٌ pactum

iniit. حَدَّثَ مَكْلَأٌ ei prae-

ceptum dedit. قَوْلَى حَدَّثَ sententiam mutavit, promis-

sis non stetit. مَكْلَأٌ وَمَكْلَأٌ

Evangelium. مَكْلَأٌ حَدَّثَنَا mentione dignus.

مَكْلَأٌ مَكْلَأٌ حَدَّثَنَا ineffabilis.

لَمْ يَمْكُلْ حَدَّثَنَا noli esse sollicita ; theolo-

gice : Verbum Dei, Jesus Christus et hoc sensu masc. ;

it. mens, intellectus ; gramm.

verbum, definitio ; مَكْلَأٌ

شَفَعَةٌ verbum passivum.

مَكْلَأٌ حَدَّثَنَا verbum activum.

مَكْلَأٌ فَهْدَخْتَارٌ verbum imperati-

vum. مَكْلَأٌ مَكْلَأٌ adjectivum,

participium, infinitivum. مَكْتُوبٌ adverbium ; *adverb.* حُكْمٌ in hoc ipso verbo : statim. حُكْمٌ ore tenus, verbo.

حُكْمَةٌ dimin., verbulum.

حُكْمَةٌ verbalis.

حُكْمَةٌ verbosus, loquax.

مَكْلُومٌ sermone, ratione prædictus, eloquens ; loquax. سُعْدَةٌ vinum mysticum. مَهْمَّةٌ loquendi facultas.

مَكْلُومٌ loquacitas.

مَكْلُومٌ sermone prædictus, rationalis.

مَكْلُومٌ part. pass. Pe. loquela prædictus, rationalis ; prudens; spiritualis; eloquens, disertus, rhetor ; ad dialecticam pertinens ; أَعْصَمَةٌ rationabile obsequium.

أَعْكَلَةٌ irrationalis; gramm.

أَعْكَلَةٌ vox articulata. مُكْلَمٌ مُكْلَمٌ ars logica.

مَكْلُومٌ dimin., rhetor mediocris.

مَكْلُومٌ logicus, rationalis ; dialecticus ; peritus.

مَكْلُومٌ secundum leges logicæ.

مَكْلُومٌ rationalitas; ratiocinatio ; pronuntiatio; elocutio, eloquentia, rhetorica.

مَكْلُومٌ et مَكْلُومٌ eloctio, sermo ; narratio ; oratio, discursus,

tractatus ; homilia ; stylus.

حُكْمٌ وَمَكْلُومٌ vir eloquens.

مَكْلُومٌ dimin. præc., oratione uincula.

مَكْلُومٌ sermo, tractatus ;

مَكْلُومٌ آنَجَانَةٌ theology.

مَكْلُومٌ مَهْمَّةٌ doxologia.

مَكْلُومٌ loquens.

مَكْلُومٌ enuntiabilis ; c. لَمْ يَكُنْ ineffabilis.

مَكْلُومٌ مَهْمَّةٌ adv. ; c. لَمْ يَكُنْ ineffabiliter.

مَلَائِكَةٌ et مَكْلُومٌ ، μελαγχολία, melancholia, attracta bilis, moestitia ; amentia.

مَهْمَّةٌ ، مَكْلُومٌ ، مَكْلُومٌ et مَهْمَّةٌ ، مَهْمَّةٌ ، f. مَهْمَّةٌ ، leno, lena, hermaphroditus, cfr. μαλλάξ , scortum.

مَهْمَّةٌ lenocinium.

مَهْمَّةٌ μαλλάξ , leno.

مَلْحَنٌ albugine oculorum, gramiis laborans. ; it. ut seq.

مَلْحَنٌ albugo oculorum, gramiæ ; oculorum sordes.

مَلْحَنٌ , v. s. دَحْفَنٌ .

مَلْحَنٌ , v. s. مَلْحَنٌ .

مَلْحَنٌ μέλος , melo (gall. melon).

مَلْحَنٌ , fut. نَعْكَمَ depilavit,

vellicavit ; *cfr.* **מַקֵּט** et ar.
مَلَسْ , lævigavit.

Ethpe. **מַקְרָב** pass.

مَكْرُمًا calvities ; *it.* calvus.

مَكْرُمًا laboriosus.

מַלְחֵם vas, labrum æneum in
quo vestes lavantur.

مَحْكَمَةً signum Zodiaci ; *it.* ho-
roscopus.

مَحْكَمَةً astrologia, magia.

مَحْكَمَةً ad Zodiacum pertinens.

מַבּוֹל , **מַפְתֵּה** , heb. di-
luvium, torrens; gurges, tem-
pestas.

مَمْفَدًا , مَمْفَدًا et **מַמְפָּדָה** mam-
mona, divitiae.

מַמְפָּדָה et **מַמְפָּדָה** chelidonium
planta.

מַמְפָּדָה glaucium (*gall.* pavot
cornu).

מַעַל vel **מַעַל** , heb. **כָּרֶב** , ar. **عَنْ** :
1º pron. interr. com. generis
et numeri ; *it.* **מַהְנֵה** , contr. ex
מַעַל et **מַעַל** , f. **מַעַל** ex **מַעַל** et
מַעַל : quis ? quæ ? quinam ?
quænam ? *nng.* quid ? **אַיְלָה** quis
es tu ? **אַיְלָה** quis est tu ? **אַיְלָה**
quinam estis vos ? **אַיְלָה** quæ
מַעַל **אַיְלָה** quænam est
mater mea et quinam fratres
mei ? **מַהְנֵה** quis est qui ? ; *nng.*
quid est quod ? **אַיְלָה** quod

nam est nomen ejus ? ; **מַהְנֵה**
quodnam est nomen tuum ? ;
in casu obliquo : cujus ? cu-
jusnam ? **הַמְהֻנָּה** cujusnam
filius est ? **אַיְלָה** cujus-
nam filia es tu ? **הַמְהֻנָּה** cui ?
מַעַל pro **מַעַל** propter
quid ? quare ? **מַעַל** a quo ?
מַהְנֵה **אַיְלָה** cujatis sit
iste nescio.

2º seq. ?, vel **וְנִי** , est pron.
indef. correlat. : is qui, qui-
cumque, quæcumque, quis-
piam ; *nng.* præc. al. pro-
nom. demonst. vel indefin. : **מַהְנֵה**
בְּזַעֲמָה is cujus est ; **מַהְנֵה**
vel **מַהְנֵה** quisquis, qui-
cumque, omnes qui, *ar.* ar. ;
מַהְנֵה **וְנִי** ille qui egit rem.
וְנִי **בְּזַעֲמָה** domus cujus-
cumque. ? **מַהְנֵה** nemo est qui.

3º adhibetur c. variis particu-
lis. **וְנִי** cuicunque.
וְנִי **אַחֲרָה** sicut is
qui, sicut. **וְנִי** apud
quemlibet. **וְנִי** utinam. **מַעַל**
vel **מַעַל** et **מַעַל** in pos-
terum, in annum sequentem.

מַעַל vel **מַעַל** , *μέν* , conj. græca,
quidem ; *primo verbo phrasis*
postponitur , *nng.* seq. **כִּי** ,
דָּא , vel **אַלְפָה** , ergo, *in phrasi*

*consequenti; it. μῆν, profecto,
sane. ← οὐδὲ λαλεῖ μῆν, at
vero.*

מִתְהָ, it. **מַמְ**, contr. a
m̥ et pron. inus. **לִי**, cfr. **מַלְאָ**,
לִמְ; est:

1º pronom. interrogat. rerum
seu neutrum, ar. مَاذَا, quid?

مَنْ هُوَ فِي الْأَرْضِ بِهِ مَنْ يَعْلَمُ
quid prodest circumcisio? مَنْ هُوَ فِي السَّمَاوَاتِ بِهِ مَنْ يَعْلَمُ
quid est tuum nomen? مَنْ هُوَ فِي السَّمَاوَاتِ بِهِ مَنْ يَعْلَمُ

quid igitur ? ; مُهْنَهْ quid est hoc ? quid ? فَهَذِهْ quid est, fili, hoc verbum tuum ? مُهْنَهْ مُهْنَهْ non compertum est quid de illo factum sit ; in oratione indirecta præfigi potest , voci مُهْنَهْ حَدَا مُهْنَهْ :

وَمَنْتَأْيِدٌ حَذَّلَ ab eo petiit
 quænam esset ratio; it. si-
 gnificat quis, qualis; *interr.*
 vel *admir.*: وَمَنْتَأْيِدٌ مُّنْ حَسْتَمْ
 quis, qualis sis ex hominum
 genere? وَمَنْتَأْيِدٌ utrumne?

2° seq. ?, pronom. est correlat.:
id quod; وَهُوَ مَنْ quod vo-
lueris.

مُهْنَد فَهْمِنْتَا ۖ
quodnam jussum? مَهْدٌ فَهْمِنْتَا
ماً / quænam sunt discrimina?

4° *adverbialiter* : quomodo ?
 quare ? مُنَّا حَمْبَرْ مُنَّا quomodo
 se habent ? ; *plerumque tamen*
præfig. مُنَّا، مُنَّا et *aliee parti-*
culæ. : حَمْنَا in quo ? ex quo,
 quare ? qua ratione ? حَمْنَا, حَمْنَا
 ad quid ? cur ? quomodo ?
 مُنَّا مُنَّا مُنَّا et مُنَّا مُنَّا quare ?
 مُنَّا مُنَّا quidditas.

 vel , heb. , ar.
, particula significans:

^{1°} *partitionem*: ex, nonnulli, nonnullæ, nonnulla, aliquid ex; حَسْبُ مِنْهُ مَهْتَرْسَ, quadam die. أَمْ مِنْ إِيمَانًا ؟ sunt homines qui أَخْمَفَهُ ٥٠١٦٥٥ aliqui permittunt. حَسْبُهُ وَقْتُنَا Aliquis ex optimatibus. حَسْبُهُ ٥٠١٦٥٥ quidam hujus erroris assecla. ٥٠١٦٥٥ ... حَسْبُهُ nonnulli ... nonnulli. حَسْبُهُ وَهُمْ حَسْبُهُ aliquid ex tuo spiritu in nobis est. حَسْبُهُ لا حَسْبُهُ aliquos ex nobis occidit. حَسْبُهُ مُحَكَّمَةٌ, ex re pauperum.

2º originem, principium actionis, causam, rationem, nnq. materiam ex qua : a, ex, propter ; مَنْدَبٌ مَّنْدَبٌ ab eo scriptus est. مَنْدَبٌ مَّنْدَبٌ ab eo occisus est. مَنْدَبٌ مَّنْدَبٌ vestis e pilis camelii. مَنْدَبٌ

مَنْتَهَا مَنْ دَهْتَا selecta
ex libro. مَنْ كَبْ مَنْ مَنْ
solus eram. تَهْدِي تَهْدِي in se ;
تَهْدِي تَهْدِي per se, segregatim.
تَهْدِي تَهْدِي ex se ipso ; pro
seipso ; seorsim. تَهْدِي تَهْدِي a se
ipso. تَهْدِي تَهْدِي ex scipso.
تَهْدِي تَهْدِي تَهْدِي præ fame periit.
تَهْدِي تَهْدِي ex hoc, propterea.
تَهْدِي تَهْدِي تَهْدِي timuimus prop
ter animas nostras.

3º separationem, discessionem
fugam, respondet part. ar.
عَنْ , a, ab ; مَنْ مَنْ مَنْ ab eo
caveas. تَهْدِي تَهْدِي ab eo su
persedit. تَهْدِي تَهْدِي ab eo fugit.
تَهْدِي تَهْدِي تَهْدِي sine velo.
تَهْدِي تَهْدِي تَهْدِي contra vo
tum castitatis. تَهْدِي تَهْدِي مَنْ
مَنْ مَنْ intra triginta et quin
quaginta. تَهْدِي تَهْدِي ultra ip
sum. تَهْدِي تَهْدِي sub ipso, in
fra ipsum. تَهْدِي تَهْدِي radicitus.

4º in comparat. id. est ac
quam, præc. كُلْ , مَنْ , vel ab
solute: مَنْ وَسْلَهْ أَحْمَارْ مَنْ مَنْ
مَنْ qui amat patrem aut
matrem plus quam me. تَهْدِي مَنْ
كُلْ مَنْ vel تَهْدِي مَنْ مَنْ
iiis numero majores. تَهْدِي
مَنْ كُلْ مَنْ quia prior
me est. تَهْدِي مَنْ مَنْ
maju est dicentibus : major est

res quam ut describi possit.
وَجْهْ مَنْ præter solitum.

5º est particula temporis, loci:
مَنْ وَصْفَا sub vespere.
مَنْ وَصْفَا a vespere usque ad.
مَنْ مَنْ tempore aestivo.
مَنْ مَنْ مَنْ مَنْ de die in diem.
مَنْ مَنْ a bim
atu et infra. تَهْدِي مَنْ a tempore sui episcopatus.
مَنْ مَنْ مَنْ dum vivit. تَهْدِي مَنْ sede a dextris meis.
أَيْمَنْ مَنْ مَنْ a sinistra parte.

6º c. , conjunctio est : مَنْ وَنْفَهْ
وَمَنْ postquam exiit diabolus.
تَهْدِي تَهْدِي a tempore quo erat.

7º Tandem مَنْ conjungitur
variis particulis : مَنْ مَنْ contr.
a بِإِنْ , statim; مَنْ مَنْ denuo;
iterum ; مَنْ مَنْ post. مَنْ مَنْ
a tergo. مَنْ مَنْ priusquam;
خَلْقَهْ مَنْ مَنْ et خَلْقَهْ مَنْ unquam,
ab aeterno; مَنْ دَيْنَ a tempore
quo.

هَلْ, fut. مَنْتَا , heb. מָנַחַת , inf. مَنْتَا , numeravit, re
censuit ; reputavit. Part. act. مَنْتَا دَهْخَرْ , مَنْتَا nu
merans stellas : astrologus.
Part.pass. مَنْتَا .
Ethpe. مَنْتَا pass.
Pa. مَنْتَا concessit, tribuit.

Ethpau. أَمْدَنْتْ singillatim numeravit.

أَمْدَنْتْ numeratio, census; enumeratio, computatio; computus, æra; catalogus. مُحْسِنْتْ

æra Seleucidarum, (an. 312-311 a. Ch). وَلَا مَدِينَمْ innumerabilis. حَدَّمْتْا مُحْسِنْتْ numeri ordinales.

مُحْسِنْ ad numerum pertinens; حَدَّمْا مُحْسِنْ nomen numerale; gramm. مُحْسِنْ فَعْلَمْ numerus simplex seu cardinalis, مُحْسِنْ لُحْمَنْ numerus ordinalis, مُحْسِنْ مَدْقَلَمْ numerus distributivus.

مُحْسِنْ numerator.

مُحْسِنْ enumeratio; arithmetica.

مُحْسِنْ pl. مُحْسِنْ , pars, portio sorte adscripta; gradus; in pl. reliquiae *Sanctorum*. vel أَمْ بِهِ مُحْسِنْ ex parte. حَفْلَمْ varie, omnimode. حَمْدَمْ حَمْدَمْ sorte quam merentur.

مُحْسِنْ ex parte, partim, aliquatenus.

مُحْسِنْ id.

Ethpa. مُحْلَلْ , den. a مُحْسِنْ , adjunctus est.

مُحْسِنْ et مُحْسِنْ particularis, partialis; ex parte extans.

مُهْنَدْنَهْ particularitas.

مُهْنَدْنَهْ gramm. serviles litteræ, مَوْ . مَلْ . l quæ verbo prefixæ ad ejus inflexionem inserviunt.

مُهْنَدْنَهْ numerabilis.

مُهْنَدْنَهْ numerabilitas.

مُهْنَدْنَهْ , et مُهْنَدْنَهْ , pl. pilus, crinis; nervus, chorda citharae; cithara. حَمْنَهْ مُهْنَدْنَهْ vel حَمْنَهْ مُهْنَدْنَهْ decachorda.

مُهْنَدْنَهْ chordas habens.

مُهْنَدْنَهْ , pl. مُهْنَدْنَهْ et مُهْنَدْنَهْ emph. مُهْنَدْنَهْ , assyr. manu, يَمْزَخْ , pondus, drachma; cfr. heb. מַנְחָה et ar. مَنْحَنْ .

مُهْنَدْنَهْ et مُهْنَدْنَهْ vermis, curculio (gall. charançon).

مُهْنَدْنَهْ μανίχης, furor.

مُهْنَدْنَهْ , vox arab. قَنَارَةَ , turris templi Moslemorum; cfr. مُهْنَدْنَهْ candleabrum, s. ةَهْ .

مُهْنَدْنَهْ , vox ar. مِنْجَرْ , suggestum.

مُهْنَدْنَهْ مُهْنَدْنَهْ , مُهْنَدْنَهْ machine spec. bellica; equuleus.

مُهْنَدْنَهْ , pl. مُهْنَدْنَهْ مُهْنَدْنَهْ μανίχικη , cfr. ar. مَنْجِيْقَ , ballista.

مُهْنَدْنَهْ et مَهْبَمْ μ.χνδύχε , chlamys; pallium.

مُهْنَدْنَهْ vox lat., mandatum.

مُهْنَدْنَهْ مُهْنَدْنَهْ , مُهْنَدْنَهْ vox lat., mantle; sudarium, cfr. ar. مَنْدِيلْ :

مَدْبُوْلَهْ وَهْ وَهْ , *vide* مَدْبُوْلَهْ وَهْ .
 مَدْسَنْ , *v. s.* مَدْسَنْ .
 مَدْسَنْ , *v. s.* مَدْسَنْ .
 مَدْسَنْهَا , *id. q.* مَدْسَنْهَا مَدْسَنْ , nummus ;
 signum ; forma, modulus.
 مَدْسَنْهَا patera, *v. s.* مَدْسَنْ .
 مَدْسَنْهَا et مَدْسَنْهَا viola ; *cfr.*
 pers.-ar. بَنْسَجْ , *id.*
 مَدْسَنْ et مَدْسَنْ , *heb.* نَسْ et ar. مَنْ ,
 manna.

مَدْلَلْ , *inus.* - *Pa.* مَدْلَلْ per-
 venit, perrexit ; pervenire
 fecit, adduxit. مَدْلَلْ لَاهْ وَهْ
 Edessam venit. مَدْلَلْ أَحْرَنْ ad-
 fuit tempus.

Ethpa. مَدْلَلْ pervenit, profec-
 tus est.

مَدْلَلْ مَدْلَلْ adventus ; profectio.
 id. مَدْلَلْ

مَدْلَلْ مَدْلَلْ adventus.
 مَدْلَلْ , *ar.* مَنْشُورْ , diploma.
 مَدْلَلْ , *ex* مَدْلَلْ et مَدْلَلْ ,
 nudius tertius ; *cfr.* مَدْلَلْ .
 مَدْلَلْ μέση , medium. مَدْلَلْ
 وَهْ وَهْ مَدْلَلْ forum, urbis platea.

مَدْلَلْ , *fut.* نَعْدَمْ , *heb.* نَعْدَمْ
 et نَعْدَمْ , fluxit ; tabuit, foetuit,
 putruiit ; coagulavit, densum
 fecit ; densus factus est. *Part.*
pass. مَدْلَلْ , *f.* emph. مَدْلَلْ ,
 pl. m. مَدْلَلْ , *emph.*

مَدْلَلْهَا مَهْمَتْ , *f.* emph. مَهْمَتْ ;
 adj. putridus, tabidus, maci-
 dus ; liquefactus, solutus, hu-
 midus.

Ethpe. لَاهْ مَهْمَتْ putruiit, putre-
 factus est, contabuit. لَاهْ مَهْمَتْ
 كَحْ contabuit cor nostrum.

Pa. مَهْمَتْ putrefecit ; condensa-
 vit.

Aph. لَاهْ مَهْمَتْ putrefecit ; liquefe-
 cit, mollivit ; *it.* derisit, de-
 nom. a مَهْمَمْ mimus.

مَهْمَمْ et مَهْمَمْ لَاهْ مَهْمَمْ putredo,
 putrefactio, foetor.

مَهْمَمْ et مَهْمَمْ coagulum ; lactens,
 infans ; *cfr.* ar. مَصْ , suxit.

مَهْمَمْ cyperum planta (gall.
 souchet) ; *it.* ut seq.

مَهْمَمْ et مَهْمَمْ coagu-
 lum.

مَهْمَمْ putredo, tabes.

مَهْمَمْ putrefaciens.

مَهْمَمْ putrefactio.

مَهْمَمْ putrescens.

مَهْمَمْ coagulum.

مَهْمَمْ vel مَهْمَمْ vox latina,
 mansio seu statio itineris ;
 parasanga.

مَهْمَمْ inusit. - *Ethpa.* لَاهْ
 diruptus est.

لَاهْ مَهْمَمْ funis ; vinculum spec.
 ligneum.

مَدْحُودٌ، v. s. مَدْحُودٌ.

مَسْتِيك *mastix*, mastix,
resina arborum.

μαστίχη μαστίχιον, resina mastichis.

מַחְדָּה *v. s.* **مَحْدَهٌ** et **مَحْدَدٌ**, *velum calicis; cfr. heb.*
מַכְנָה *tegumentum, a נִכְנָה.*

مُهْكِمٌ, ar. مِنْكِينٌ, pauper, miser, v. c. deriv. s. rad. **مَكِّمَتْ**.

محل ، v. s. میختن

مَهْمَلًا، v. s. سَ.

palmae; inde funis e fibris.

منسّاس، *chald.* מַבְטָח et ar. مَهْمَعًا stimulus bubalorum; it. trutina, cfr. هُمَّ.

مُهْمَّةً , *semper in st. c.* مُهْمَّةً
vel مُهْمَّةً , id quod satis est,
sufficientia, mensura; *cfr. heb.*
מִסְהָה , *st. c.* בַּשְׁתָּה ; *inde usur-*
patur pro præpos. : secun-
دُمْ مُهْمَّةً بِعْدَ مُهْمَّةً
secundum, juxta: مُهْمَّةً مُهْمَّةً
secundum mensuram necessi-
tatis tuæ. أَحْدَى مُهْمَّةً مُهْمَّةً
tempus. ۱۰۶ وَمُهْمَّةً مُهْمَّةً
quod tibi sufficiens est; *seq.* ?
pro ratione, juxta quod, ut ;
usquedum. وَمُهْمَّةً مُهْمَّةً
ut melius scias. لِمُهْمَّةً مُهْمَّةً ne.
وَمُهْمَّةً حَمْدَةً propter.

مَعْدُومٌ μέσπιλον, mespilus (gall. néflier).

مَهْمَّةٌ et deriv., v. s. **مَهْمَّ**.

ט

מִסְמֵךְ , fut. ; נַדְמֵה tradidit,
 transmisit, *cfr. neo-heb.* מִסְרָה id., *unde* מִסְרָה traditio; it.
 accusavit; detulit, calum-
 niatus est; contempsit, *cfr.*
 מִסְמֵךְ; tradidit morti, hostibus.
 Part. præs. מִסְמֵחַ ; adj.
 audax, impudens.

Ethpe. ةَمْلِي pass.

Pe. : ~~ه~~ accusavit; impudenter locutus est: contempsit.

Aph. **مَهْمَةٌ** contempsit; *c.* **مَهْمَةٌ** ausus est, obnixus est.

الاتهام accusatio, delatio; calumnia.

مُهَمَّةٌ audacia, criminatio,
calumnia, contemptus.

مُهَمَّهٌ delator.

لِوْهَمْ delatio.

لُؤْلُؤَةٌ calumnia, contemptus.
لَعْنَدَةٌ delatio; impuden-
tia.

L'île et l'eau à la fin.

It is idem as the first.

— 1 —

مکالمہ

Líñ f. val. lín obolus

L'is. l'is. et una l'is. n/

مَدْتَسٌ , *heb.* مدְתָס , *ar.* مدّتَس , *st. c.* مدّتَس , viscera, intestina ; *et per extens.* lumbi, venter; *c. suff.* مدّتَسٌ viscera ejus. مدّتَسٌ دَهْمَنٌ intestinum cœcum. مدّتَسٌ أَوْمَانٌ colon. مدّتَسٌ وَأَوْخُدٌ dysenteria. مدّتَسٌ وَأَوْخُدٌ *vel* مدّتَسٌ أَوْخُدٌ vermes, lumbri; fissuræ terræ. مدّتَسٌ , *pl.* مدّتَسٌ viscera ; fissura ; lumbri. مدّبٌ , *fut.* تَعْجِبٌ vacillavit. مدّبٌ , *fut.* تَعْجِبٌ compressit مدّنٌ locus, regio, *heb.* مدّنٌ a rad. צִנְעַן . مدّنٌ , *pl.* مدّنٌ pili; cincinni ; *cfr.* مدّنٌ . مدّنٌ , *vide* حَمْنٌ .

مدّصٌ, *fut.* تَمْكَحٌ , compressit, conculeavit ; *uvas* calcavit ; allisit, obruit ; discerpsit, vexavit *diabolus*; *cfr. ar.* مَقْسٌ . *Part. pass.* مدّصٌ ; corruptus, turpis; obsessus *a diabolo*.

Ethpe. مدّصٌ *pass.*

Pa. مدّصٌ contrivit, conculeavit. *Part. pass.* مدّصٌ ; *adj.* sceleratus.

Ethpa. مدّصٌ *pass.*

مدّصٌ attritio, allisio ; tormina viscerum, *ar.* مَفْصٌ .

convulsio, epilepsia, vexatio. مدّصٌ , *pl.* مدّصٌ vexatio ; deliramentum.

حَصٌ , *v. n.* مدّصٌ . مدّصٌ , *pl.* مدّصٌ , *v. s.* مدّصٌ . مدّصٌ trulla.

مدّرٌ , *cfr.* مدّر , *heb.* مدّر et *ar.* مَصَّ , *fut.* تَعْدُوا suxit, exsuxit. *Part. pass.* مَرْوا مَوْمَدٌ exsuctus, *inde* aridus. *Pa.* مَرْمَمٌ suxit ; expressit, stillatim defæcavit ; aruit. *Ethpa.* مدّرٌ exsuctus est. *Aph.* مَرْمَمٌ exsuxit, expressit. مدّرٌ et مَوْمَدٌ exsuctio ; stillatio, expressio.

مدّرٌ et مَهْوَمٌ id.

مدّرٌ et مَوْمَدٌ colum (gall. filtre) ; faex vini.

مدّرٌ , *v. s.* مَرْوا .

مدّرٌ potuit; *in usit. in Pe.* *cfr.* مدّر et *ar.* مَضِي (عَى الْأَمْرِ) rem assecutus est. *Part. pass.* مَرْوا , مَوْمَدٌ potens, et ad modum *v. impersonalis*, potest, possibile est, *st. c. f.* مَوْمَدٌ , *pl.* مَرْوا إِنْ ; مَوْمَدٌ vel مَرْوا آيَهٍ مَوْمَدٌ possum, مَرْوا آيَهٍ مَوْمَدٌ potes; مَوْمَدٌ possumus, مَوْمَدٌ vel آيَهٍ مَوْمَدٌ .

potestis, مُو potuit.

impossibile mihi est ut. مُو cognoscere potest quis.

esse potest. مُو si possibile fuisset. مُو quantum possibile est; seq. مُو potens viribus: potens, capax; potest. مُو vel مُو omnipotens.

ipsa prævalebat illis. مُو possibile.

Ethpe. مُو potuit; seq. sæpe al. verbo in fut. c. præf.,

vel infin. c. مُو; perficere potuit. مُو non potest. مُو potens fuit; c. مُو, vel مُو, par fuit, prævaluit. مُو vel مُو سُنْدَهْ prævaluit contra eum.

Aph. مُو potuit.

et مُو potestas.

, f. emph. مُو, potens; possibilis; f. pl. مُو possibilia. لام مُو impossibilis. و مُو id fieri nequit ut.

مُو possibiliter.

مُو potestas, facultas, possibilitas. مُو Dei potentia.

مُو possibilis.

مُو, fut. مُو in medio fuit, in medio adstitit.

Pa. مُو ut Pe.; it. in medio posuit, ad medium perduxit opus; trop. se interposuit, mediator fuit. مُو in medio stetit. بُو مُو dimidia ex parte fraudavit.

Ethpa. مُو interpositus est, se interposuit; in medio stetit.

Aph. مُو intervenit.

مُو moderate.

مُو, st. c. مُو, c. suff. مُو vel مُو, medium, centrum; intervallum temporis; trop. consensus; adverb. c. مُو et مُو, in medio; publice: c. مُو, e medio; مُو media nocte. مُو sub meridiem; it. sæpe sine præp., in st. const., inter, in medio: مُو مُو inter hortos. مُو مُو in medio mari. مُو أَبْهَنْتَ patrem meum inter et tuum.

مُو, f. emph. مُو, medius, in medio situs; medium locum tenens; mediocris; mediator; in f. emph.

medius digitus. حَسْدٌ حَسْدٌ
نَّ حَسْدٌ mediator est inter
nos et Filium. هُرْخَنْ حَسْدٌ
حَسْدٌ حَسْدٌ statura medioris
est.

مُوْحَسْدَمَا مُوْحَسْدَمَا medietas, medium ;
mediatio, interventio; gramm.
مُوْحَسْدَمَا مُوْحَسْدَمَا interjectio.
مُوْحَسْدَمَا mediate.
مُوْحَسْدَمَا et مُوْحَسْدَمَا مُوْحَسْدَمَا medie-
tas.

حَسْدَرْ , fut. نَهَدَ وَ suxit, exsu-
xit. Part. act. مُهَارْ , f. مُهَارْ .
Part. pass. مُهَارْ aridus; cfr.
هَبْ heb. מִיחָץ et ar. مَصْ مَهْ et
مُهَارْ exsuctio.

مُهَارْ vel مُهَارْ instrumentum
quo medicamentum in nares
infunditur ; it. sugens ; depila-
tio.

مُهَارْ in pl., medicamenta ad
gargarizationem inservientia.
مُهَارْ ariditas ; exsuctio.

حَسْدَرْ , fut. نَهَدَهْ , pandiculatus
est, oscitatus est ; cfr. مَهْ .
Ethpa. مُهَارْ id.
مُهَارْ et مُهَارْ مُهَارْ pandiculatio.

مُهَارْ et مُهَارْ مُهَارْ μικτόν ,
(μίκτηγμα), emplastrum ; li-

gamen ; pulmentum ex fari-
na cum melle et butyro.

مَهْ مَهْ , ar. مَهْ , bdellium.
مَهْ مَهْ et مَهْ مَهْ
μάκελλον , macellum.

مَهْ مَهْ f. gallina ; upupa.
مَهْ مَهْ scyphus, poculum ; men-
sura, id. q. مَهْ مَهْ .

مَهْ مَهْ , v. s. مَهْ .
مَهْ مَهْ albumen ovi, v. s. مَهْ مَهْ .
مَهْ مَهْ , v. s. مَهْ .

مَهْ مَهْ et مَهْ مَهْ , v. s. مَهْ .
مَهْ مَهْ , vide مَهْ .
مَهْ مَهْ , v. s. مَهْ .

مَهْ مَهْ مَهْ مَهْ مَهْ μακρόθυμος ,
longanimis.
مَهْ مَهْ مَهْ longanimitas.

مَهْ مَهْ , emphat. مَهْ مَهْ , Domi-
nus ; de Deo et Christo tan-
tum ; it. مَهْ مَهْ , emph. مَهْ مَهْ do-
minus, possessor, st. const.
مَهْ مَهْ , sed cum affix. مَهْ مَهْ tantum :
مَهْ مَهْ , مَهْ مَهْ , مَهْ مَهْ etc. domi-
nus tuus, noster, eorum ;
مَهْ مَهْ dominus meus, inde
titulus dignitatis spec. viris
ecclesiasticis vel sanctis col-
latus , ar. مَهْ مَهْ , مَهْ مَهْ
vel مَهْ مَهْ sanctus Ser-
gius, pl. abs. مَهْ مَهْ , emph. مَهْ مَهْ ;
مَهْ مَهْ et مَهْ مَهْ , raro مَهْ مَهْ , st. c. مَهْ مَهْ ;

cfr. ar. مَنْ , vir ; أَكْتَنْ , vir ; مَنْ , pater deorum : Jupiter. مَنْ vel حَسْدُا paterfamilias ; it. *absol.* مَنْ parentes ejus. مَنْ سَهْدَا creditor. virtute præditus, id. q. ar. رَبْ et صَاحِبْ . مَنْ sapiens, philosophus. مَنْ vel حَسْدَا omnipotens. مَنْ possessor vineæ. مَنْ وَحْشًا dolore afflictus. مَنْ وَحْشًا auctor libri, possessor libri. مَنْ Dominus dominorum. مَنْ Dominus dominorum. مَنْ pl. مَنْ تُحْصِّنْ vir dives, potens. مَنْ vir jejunii : jejunio deditus. مَنْ vir judicii. مَنْ vir magni nominis. مَنْ horroscopi.

مَنْ , st. c. لِيْلَى , pl. مَنْ domina ; مَنْ لِيْلَى materfamilias. مَنْ لِيْلَى سَلَلْ verbum virtute prædictum : efficax ; c. suff. مَنْ domina mea, unde titulus honoris, pro sanctis feminis, ex.: مَنْ مَنْ مَنْ domina Maria : Beata Virgo.

Ethpa. مَنْ لِيْلَى , v. denomin. a مَنْ , dominus factus est ; possessor factus est.

مَنْ dominium, dominatio ;

possessio. pl. مَنْ مَنْ Dominatones, ordo Angelorum.

مَنْ نَامَ domini more ; cum potestate, auctoritate ; proprie, id. q. gr. κυρίως .

مَنْ نَامَ , pl. , مَنْ نَامَ et مَنْ نَامَ , id. q. مَنْ مَنْ .

مَنْ نَامَ et مَنْ نَامَ , مَنْ نَامَ ad dominum pertinens ; Dominicus ; principalis, primarius, potestatem habens ; magnificus ; proprius ; verus, realis.

حَتَّا وَ حَتَّا مَنْ نَامَ festa Domini. مَنْ نَامَ nomen proprium. فَكَرْ مَنْ سَدَا anno tali ærae christianæ.

مَنْ نَامَ et مَنْ نَامَ dominatio, potestas ; proprietas.

مَهْ وَ نَامَ , v. s. مَهْ وَ نَامَ , pl. مَنْ سَدَا baculus id. q. مَهْ وَ نَامَ ; it. al. sensu, v. s. بَرَأَ .

جَنْ inus.; cfr. heb. כְּרָא et it. ar. مَرَى contendit.

Pa. مَنْ بَعْ contendit, æmulatus est, c. حَمْ vel حَمْ ; imitatus est, c. حَمْ vel حَمْ , similis fuit; vid. al. sensu s. مَنْ .

Ethpa. مَنْ لِيْلَى id.

مَهْ وَ نَامَ imitatio, comparatio.

مَهْ دَنْ مَنْ imitator, æmulator.

مَهْ دَنْ مَنْ certatim.

|^{وَ}^{كُلُّ} ^{مِنْ} ^{هُنَّ} ^{أَعْدَادٌ} | et |^{وَ}^{كُلُّ} ^{مِنْ} ^{هُنَّ} ^{أَعْدَادٌ} æmula-
tio, imitatio.

مُنْتَهٰيَةً imitator.

מִדָּמָה *et* **מְדֹאָמָה** succus uvarum recenter expressus, *a* **לְמַה**, *cfr.* הַרְשָׁ mustum, *a* **גַּרְשָׁ.**

فِيَـ, fut. **فَوْقَـ** vacillavit; trop. debilis fuit.

Aph.  vacillavit; vacil-
lare fecit.

لُجْنَة vacillatio; volutatio; *cfr.*
ar. **تَمَرُّع**, volutatus est.

مَذْنٌ, *ar.* مَرْجَةٌ, *pratum*; *it.*
 lutum rubrum, *ar.* مَفْرَةٌ; *al.*
 sensu part. *Aph. v.* مَدْنٌ. قُبْلَةٌ.
 مَذْنٌ, *cyperum.*

Ли́тъ, ut **Л**и́тъ, marchio.

λύγιστο, pl. **λύγιστα**, μάρπαγνα,
flagellum.

מְגֻדָּלָה, pl. מְגֻדָּלָה cfr.
 מַגְדָּלִיתָה, targ. מַגְדָּלִיתָה,
 et ar. مَرْجَانٌ, margarita,
 gemma; trop. particula sanc-
 tæ Eucharistiae; reliquiae;
 virginitas.

وَهُمْ ، fut. وَهُمْ descivit,
rebellavit; obstitit, restitit,
c. هُمْ vel هُنْ ; evasit, fugit,
c. هُمْ ; confugit ad, c. هُنْ ; هُمْ وَهُنْ
أَمْ وَهُنْ conjurationem fecerunt ;

مَدِينَةٌ وَمَنْصُورٌ fortis evasit
Part. act. **مَدِينَةٌ وَمَنْصُورٌ**; rebellis.
Part. pass. **مَنْصُورٌ** effugiens, fugitus, lassus; al-
 tus impervius locus.

Ethpe. و مهلاً vi coactus est;
rebellavit.

Pa. مُهَاجِرَةً rebellavit; munivit
locum. Part. pass. مُهَاجِرَةً,
munitus; rebellis.

Ethpa. وَمَكَّاً rebellavit.
Aph. وَمَكَّاً rebellare fecit; mu-
nivit, reboravit.

الْبَرْلِيُّونْ rebellio, conjuratio; cas-
tellum, arx, acropolis; limes;
v. c. al. sensu s. الْمَنْ .

rebello; funis quo astrin-
guntur cameli.

لُوْجَه rebellio; contumacia,
audacia; *al. sensu, v. s.* **لُوْجَه**.
لُوْجَه, f. abst. **لُوْجَه** et **لُوْجَه** f. emph. **لُوْجَه** re-
bellis, apostata; contumax,
impudens; difficilis, moles-
tus.

contumaciter; despotic.

Логосъ defectio; rebellio, apostasia; contumacia.

مَنْبُرا, resistens, rebel-
lis; crudelis.

لُوْجِيْ مُهَمَّد munimentum, robur
arcis invictæ.

مَنْسَهْ وَنَا .
مَنْسَهْ وَنَهْ وَهْ et مَنْسَهْ وَنَهْ pers. مَرْزَهْ كُوش et مَرْزَهْ كُوش amaracus planta (gall. marjolaine).

مَنْسَهْ وَنَهْ et مَنْسَهْ وَنَهْ malus sylvestris.

مَنْسَهْ وَنَهْ et مَنْسَهْ وَنَهْ lithargyrum (gall. litharge).

مَنْسَهْ origanum planta, lavandula.

مَنْسَهْ وَنَهْ وَنَهْ , corruptio voc.

أَبْرَاهِيَّةِ خَوْ , parthenium planta.

مَنْسَهْ وَنَهْ et مَنْسَهْ , pers. مَرْزَهْ , confines.

مَنْسَهْ وَنَهْ , pers. مَرْزَهْ بَانْ , confiniorum dominus, praejectus, marchio.

مَنْسَهْ وَنَهْ , ar. مَرْزَهْ اَبْ , aquaeductus.

مَنْسَهْ وَنَهْ مَنْسَهْ radius pistoris ad placenta panis extendenda.

مَنْسَهْ وَنَهْ , fut. مَنْسَهْ ausus est; minus usitat. ac Aph.; cfr. heb. כְּרָה rebellavit, et ar. مَرْجَهْ protervus fuit. Part. præs. مَنْسَهْ وَنَهْ .

Ethpa. مَنْسَهْ لَيْ id.

Aph. مَنْسَهْ وَنَهْ ausus est; animose suscepit, fortiter sustinuit, c. لَيْ rei; violenter se gessit; مَنْسَهْ وَنَهْ et مَنْسَهْ وَنَهْ vel مَنْسَهْ وَنَهْ حَدَامَهْ dicere ausus est.

Ettaph. مَنْسَهْ لَيْ audacter factus est, audax fuit.

part. Pa. v. مَنْسَهْ .

مَنْسَهْ سُلْطَانْ audax; arrogans, impudens.

مَنْسَهْ سُلْطَانْ audacter.

مَنْسَهْ سُلْطَانْ audacia, impigritas; impudentia; seq. ؟ res nefaria; pl. مَنْسَهْ سُلْطَانْ audacter facta, facinora.

مَنْسَهْ سُلْطَانْ et مَنْسَهْ سُلْطَانْ مَنْسَهْ سُلْطَانْ audacia, impudentia.

مَنْسَهْ سُلْطَانْ , fut. مَنْسَهْ سُلْطَانْ , depilavit, evulsit crines etc. ; trop. eradicavit, exhausit; cfr. ar. مَرْطَ , id. et heb. כְּרָה laevigavit.

Ethpe. مَنْسَهْ لَيْ pass.

Pa. مَنْسَهْ evulsit.

Ethpa. مَنْسَهْ لَيْ pass.

مَنْسَهْ سُلْطَانْ depilatio; vestis pretiosa, ar. مَرْطَ ; pennæ.

مَنْسَهْ سُلْطَانْ dimin. plumella.

مَنْسَهْ سُلْطَانْ et مَنْسَهْ سُلْطَانْ depilatio.

مَنْسَهْ سُلْطَانْ evellens.

مَنْسَهْ سُلْطَانْ evulsio.

مَنْسَهْ سُلْطَانْ , pl. مَنْسَهْ سُلْطَانْ , dimin. مَنْسَهْ سُلْطَانْ , pallium.

مَنْسَهْ سُلْطَانْ مَنْسَهْ سُلْطَانْ μαρτυρίον , martyrium.

مَنْسَهْ سُلْطَانْ asparagus.

مَنْسَهْ سُلْطَانْ vox gall., marchio (marquis).

مَدْنَهْسَهْ , pl. مَدْنَهْسَهْ baculus, id.
q. مَهْدَهْسَهْ , v. s. مَهْدَهْسَهْ ; cfr. ar. مَهْدَهْسَهْ فَرَّان وَمَارِن hasta flexibilis du-
raque ; it. al. sensu, v. s. فَنَا .
مَدْنَهْسَهْ ureus.

مَدْنَهْ , fut. نُعْنَهْ compres-
sit, contudit; cfr. ar. مَرَسْ ma-
ceravit, et مَرَصْ compressit.

Ethpe. مَهْلَكَهْ se fricuit.

Pa. مَدْنَهْ compressit, contudit.

Ethpa. مَهْلَكَهْ pass.

مَدْنَهْسَهْ maceratio, contusio.

مَدْنَهْسَهْ maceratio, contusio ;
allisio a diabolo.

مَدْنَهْهَا id. ; ira diu recondita.

مَدْنَهْسَهْ percussus, vexatus
a dæmone vel morbo, demen-
tatus; prostratus, emollitus;
epilepticus; demens.

مَهْدَهْ iracundus.

مَدْنَهْ et مَهْدَهْ مَهْدَهْ μέρος ,
pars, portio.

مَدْنَهْ , anchora, v. s. فَهْ .

مَدْنَهْ μαχασύπιον , marsu-
pium; statera.

مَدْنَهْ , fut. نُعْنَهْ , heb. מַרְכָּז ,
ar. مَرِضَ , aegrotavit, infirmus
fuit, languit.

Pa. مَهْ مَهْ infirmus fuit; infir-
mum, aegrotum reddidit, de-
bilitavit.

Ethpa. مَهْلَكَهْ ut Peal.

Aph. مَهْلَكَهْ extenuavit, absci-
dit.

مَهْلَكَهْ morbus, infirmitas.

مَهْلَكَهْ , f. مَهْلَكَهْ , pl. مَهْلَكَهْ , f.

مَهْلَكَهْ adj., aegrotus, infir-
mus; languens.; it. v. s. فَهْ .

مَهْلَكَهْ aegritudo, languor.

مَهْلَكَهْ infirmitas.

مَهْلَكَهْ id.

مَهْلَكَهْ , v. s. فَهْ .

مَدْنَهْ , fut. نُعْنَهْ detergit,
purgavit, lavit; purum red-
didit, polivit; trop. divertit;

مَهْ مَهْ مَهْ مَهْ cogitatio-
nem avertit a. Part. pass.

مَهْ مَهْ purus; excul-
tus, prudens. مَهْلَكَهْ مَهْلَكَهْ stylus politus.

Ethpe. مَهْلَكَهْ pass.

Ethpa. مَهْلَكَهْ id.

Aph. مَهْلَكَهْ mundavit.

Ettaph. مَهْلَكَهْ pass.

مَهْلَكَهْ et مَهْلَكَهْ , it. مَهْلَكَهْ deter-
tio, expolitio.

مَهْلَكَهْ detergens, smecticus.

مَهْلَكَهْ مَهْلَكَهْclare.

مَهْلَكَهْ purificatio.

مَهْلَكَهْ mundans.

مَهْلَكَهْ mundatio, purgatio.

مَهْلَكَهْ , v. s. فَهْ .

مَهْلَكَهْ abstersio.

مَذْعُونٌ qui detergi potest.
id. q. حَافِرٌ مَذْعُونٌ pyrites, ar. قَرْقِشِينٌ.

مَذْعُونٌ , heb. מְזֻבָּה et ar. مَذْعُونٌ , fut. مَذْعُونٌ et مَذْعُونٌ , amarus fuit, amarus factus est ; impers. مَذْعُونٌ mihi amarum est : angor, c. مَذْعُونٌ vel حَافِرٌ pers. Part. præs. مَذْعُونٌ , مَذْعُونٌ , f. pl. مَذْعُونٌ .

Pa. مَذْعُونٌ , irreg. pro مَذْعُونٌ , amarum reddidit. Part. act. مَذْعُونٌ مَذْعُونٌ quasi a rad. مَذْعُونٌ .

Aph. مَذْعُونٌ amarum reddidit ; exacerbavit, dolore affecit.

Palp. مَذْعُونٌ id. ; cfr. neo-ar. مَذْعُونٌ . Part. act. et pass. مَذْعُونٌ furens.

Ethpalp. مَذْعُونٌ amarus factus est; exacerbatus est moe-
rore, dolore affectus est ; acerbe tulit; cfr. neo-ar. تَمَرَّرَ murmuravit.

اماريتودا et اماراتودا amaritudo. مَذْعُونٌ , usitatius in pl. مَذْعُونٌ , amari-
tudo ; plantæ amaræ, colo-
cynthis ; fel. مَذْعُونٌ مَذْعُونٌ , مَذْعُونٌ , مَذْعُونٌ exacerbans,
ad iram provocans.

اماريتودا amaritudo, fel. لَعْنَةً مَذْعُونٌ cucumis colocynthis. مَذْعُونٌ , مَذْعُونٌ amarus, acerbus ;

trop. sævus, horrendus. مَذْعُونٌ كَدَّ amarum est ei ; مَذْعُونٌ حَافِرٌ مَذْعُونٌ fastidivit ; حَافِرٌ مَذْعُونٌ sæviit in. حَافِرٌ مَذْعُونٌ et حَافِرٌ مَذْعُونٌ herbæ amaræ, colocynthis ; aloë.

اماريتودا مَذْعُونٌ amare, acerbe, crude-
liter.

اماراتودا مَذْعُونٌ amaritudo ; acerbitas ; nequitia. مَذْعُونٌ سُخْنٌ morosi-
tas.

اماراتودا مَذْعُونٌ et مَذْعُونٌ , pl. مَذْعُونٌ amari-
tudo ; fel, bilis ; venenum
serpentis ; humores.

اماراتودا مَذْعُونٌ biliosus, iracundus.

اماراتودا مَذْعُونٌ id. ; amarus, acerbus.

اماراتودا مَذْعُونٌ et مَذْعُونٌ amarus, a لَعْنَةً مَذْعُونٌ heb. لَعْنَةً nomen fontis amari
et solsi prope Sinaï.

اماراتودا مَذْعُونٌ iracundus.

اماراتودا مَذْعُونٌ iracundia.

اماراتودا مَذْعُونٌ , pl. مَذْعُونٌ eichorium.

اماراتودا مَذْعُونٌ exacerbatio.

اماراتودا مَذْعُونٌ مَذْعُونٌ exacerbans,
ad iram provocans.

اماراتودا مَذْعُونٌ مَذْعُونٌ exacerbatio ; amari-
tudo.

اماراتودا مَذْعُونٌ , ar. مَذْعُونٌ , myrrha.

اماراتودا مَذْعُونٌ v. denom., myrrhæ condi-
vit.

اماراتودا مَذْعُونٌ مَذْعُونٌ cuminum sylvestre ;
anethum agreste.

اماراتودا مَذْعُونٌ funis navalis ; cfr. ar.

مَرَّةٌ et رِشَّا ، funis ; it. una ex stationibus lunæ ; mortarium, a rad. قُبَّهُ q. videoas.

فَهُمَا ، v. s. .

رَجَّصَ u. مَرَّةٌ فَرَّجَصَ vox ar. procurator, nummularius.

حَمَلٌ ، heb. חַשְׁבָּה , fut. collegit spicas, etc. ; fricuit.

Part. act. مَهْمَلٌ ، مَهْمَلًا servus curam habens taurorum, bubulus.

Ethpe. مَهْمَلٌ collectus est.

Pa. مَهْمَلٌ diligenter collegit.

Part. act. مَهْمَلٌ ، مَهْمَلًا .

Ethpa. مَهْمَلٌ pass.

مَهْمَلٌ ، pl. مَهْمَلٌ spicilegium ; quisquiliae, purgamenta.

مَهْمَلٌ colligens spicas, etc.

مَهْمَلٌ spicilegium.

part. Aph. v. مَهْمَلٌ , q. videoas.

لَمْهَمَهٌ et لَمْهَمَهٌ ، lanea vestis, v. s. لَمَّهٌ .

مَهْمَهٌ ، pl. مَهْمَهٌ فَهُمْهَمٌ pannus obsoletus a forma Schaph. rad. مَهْمَهٌ .

مَهْمَهٌ مَهْمَهٌ nasus, v. s. مَهْمَهٌ .

حَمَدٌ ، cfr. heb. חַשְׁבָּה , et ar.

حَمَدٌ et حَمَدٌ tersit, fut. نَعْمَهَسْ وَخَمَدَهَسْ unxit ; per extens. baptizavit, trop. consecravit regem, etc. ;

it. mensus est, ar. حَمَدَ . Part. act. مَهْمَسْ ، مَهْمَسٌ . Part. pass. مَهْمَسٌ ، مَهْمَسٌ ، unctus, consecratus, inde subst. Messias seu Christus.

Ethpe. مَهْمَسٌ حَمَدَ pass. ; حَمَدَ se expandit super puerum, seu ad mensuram pueri se aptavit.

Pa. مَهْمَسٌ mensuravit. Part. pass. مَهْمَسٌ ، مَهْمَسٌ ، f. emph. مَهْمَسٌ ; adj. moderatus, temperatus ; metriacus.

Ethpa. مَهْمَسٌ pass.

مَهْمَسٌ ، pl. مَهْمَسٌ unguentum ; mensuratio.

مَهْمَسٌ ، emph. مَهْمَسٌ ، st. c. مَهْمَسٌ et مَهْمَسٌ ، c. suff. مَهْمَسٌ etc., pl. مَهْمَسٌ مَهْمَسٌ ، مَهْمَسٌ ، mensura ; modus, metrum ; statura ; gradus, ordo, classis ; carmen metrum, nomen metri octosyllabi ; agger ; turma. مَهْمَسٌ ، وَمَهْمَسٌ ، ager ; geometria. أَهْمَلْ وَمَهْمَسٌ ، مَهْمَسٌ praefluitum tempus. مَهْمَسٌ ، وَمَهْمَسٌ ، liber seu collectio carminum. حَمَدَ وَمَهْمَسٌ ، viri proceri, egregii. بَلْ مَهْمَسٌ ، immensus. حَمَدَ مَهْمَسٌ moderate ; in metro. بَلْ مَهْمَسٌ tuam stataram seu tuum

valorem oblitus es. حَتَّىٰ مُهْمَّسٌ مُهْمَّسًا extra modum.
مُهْمَّسٌ, pl. مُهْمَّسٌ et مُهْمَّسٌ oleum, unguentum, chrisma; litura, sedimentum. مُهْمَّسٌ مُهْمَّسٌ مُهْمَّسٌ مُهْمَّسًا وَمُهْمَّسًا oleum aromaticum. مُهْمَّسٌ مُهْمَّسًا quo ungebantur infirmi. مُهْمَّسٌ مُهْمَّسًا وَمُهْمَّسًا oleum orationis, seu oleum catechumenorum et infirmorum. مُهْمَّسٌ مُهْمَّسًا وَمُهْمَّسًا oleum sanctificatum, *ad usum baptizandorum*.
مُهْمَّسٌ unctor; mensurator; مُهْمَّسٌ, f., it. vas unguentarium.
مُهْمَّسًا et مُهْمَّسًا unctio.
مُهْمَّسًا christiane.
مُهْمَّسًا unctio; mensuratio; Messiae qualitas; Christianismus, religio Christiana.
مُهْمَّسًا وَمُهْمَّسًا oleum unctionis, oleum chrismatis, *in Sacramentis Baptismi et Confirmationis*.
مُهْمَّسًا religio Christiana.
مُهْمَّسًا unctus; Christianus.
مُهْمَّسًا oleosus, oleatus.
مُهْمَّسًا mensuratio; it. *sed al.*
مُهْمَّسًا juvenca.
مُهْمَّسًا cum mensura, moderata; مُهْمَّسًا وَمُهْمَّسًا sine mensura; it. ad instar unguenti.

مُهْمَّسًا مُهْمَّسًا moderatio, mediocritas; mensuratio.
مُهْمَّسًا مُهْمَّسًا moderatus, mensuratus, mensurabilis; c. ۲, immensus.
مُهْمَّسًا مُهْمَّسًا dimensio, dimensio-nis capacitas.
مُهْمَّسًا, fut. نَعْمَهْ مُهْمَّسًا, id. q. مُهْمَّسًا, de-corticavit.
مُهْمَّسًا, v. s. مُهْمَّسًا et مُهْمَّسًا s. مُهْمَّسًا.
مُهْمَّسًا مُهْمَّسًا genus locustæ; eruca, tinea.
مُهْمَّسًا مُهْمَّسًا animal infecundum.
مُهْمَّسًا, fut. نَعْمَهْ مُهْمَّسًا aruit, mar-cuit fructus. Part. pass.
مُهْمَّسًا; negligenter sartus vel tectus; subst. tegumentum; pl. f. مُهْمَّسًا مُهْمَّسًا coronæ laneæ.
Pa. مُهْمَّسًا neglexit.
Aph. مُهْمَّسًا marcescere fecit.
مُهْمَّسًا مُهْمَّسًا marcescentia; negligen-tia; nugæ; it. vectigal.
مُهْمَّسًا وَمُهْمَّسًا fames.
مُهْمَّسًا, ar. مَنْك, pellis, cutis, corium.
مُهْمَّسًا negligenter.
مُهْمَّسًا apprehendens, cfr. ar. مَانِيك et heb. מַנְק id.
مُهْمَّسًا مُهْمَّسًا marcescentia.
مُهْمَّسًا negligens; ineptus; extemporalis. مُهْمَّسًا مُهْمَّسًا

gramm. nomen tropice sump-tum.

مُهْمَّةٌ *pelliceus.*

مشك *moschus* (gall. musc).

مَعْنَى مُدْعَى et مَعْنَى, v. s.

مَفْعُولٌ، v. s.

لَمْهَأْ, ar. **مشق**, terra rubra
qua utuntur tinctores.

مَهْمَّ, fut. **مَهْمَّاً**, id. q. **مَهْمُّ**, ar. **مَسْ**, conrectavit.

con-rectatio.

مَهْمَهٌ *poreus*, aper.
مَهْمَهٌ, *id. q.* مَهْمَهٌ.

|لَمْدَا, et لَمْدَا, pl. لَمَّادَه et
لَمَّادَه patria, regio; civitas,
oppidum; cfr. assyr. màtu.

Laso acus grossior, obelus.

methodus, *id. q.* method, *v. s.* **լի**.
modus, **մահացած**, **մահացնել**, **մահացնելու**,
pl. **մահացածներ** methodus, modus;
tractatus.

مُهَوَّدٌ methodicus.

مَكَّ, fut. **مَكِّ**, te-
tendit *arcum etc.*, extendit,
distendit, dilatavit, in lon-
gum protraxit; c. **مَكَّ** con-
tendit, certavit; *trop.* præ-
tendit, causam *prætexuit*;
it. se extendit, perduravit;

gramm. longam reddidit litteram. مَدَّا مَدَّا مَدَّا alas expandit avis. لَكْحَةً لَكْحَةً لَكْحَةً cor suum ad Deum direxit. Part. act. مَدَّا ، مَدَّا . Part. pass. مَدَّا ، مَدَّا ; مَسْتَأْنِي مَسْتَأْنِي mens attenta. وَكَمَا وَكَمَا oratio intensior. لَكْلَمَةً لَكْلَمَةً latam habens dominationem.

Ethpe. աճածլ՝ *pass.* et *refl.*; animum intendit, se applicuit, c. ԼՃՀ.

Pali. මාද්‍ය extendit.

تَسْمِيَةٌ tensio, extensio, distension; تَسْمِيَةٌ مُّقَارِنَةٌ comparationes et similitudines.

extensio, prolixitas, *inde* spatium, distantia.

وَسَمْلَةٌ مُّدَّةٌ vit

جَنْدُون spatiōsus.

العَلْمَةُ intente, studiose.
الْعَلْمَةُ extensio, prolixitas;
duratio.

جُنْدَوْدَوْ extensivus, extensio-
nis capax.

＼**أَحْدَادُ**, fut. ＼**أَحْدَادُ**, cfr.
heb. **בְּשָׁרֶם**, et ar. **عَنْقَل**, compa-
ravit rem, c. acc. vel ＼ no-
ta accusut. rei, aut c. ＼.
＼**أَحْدَادُ** أَمْدَادُ ＼**أَحْدَادُ**
rursus protulit Job parabo-

lam suam. *Part. pass.* مَلْكُوا, مَلْكُه ; parabolice dictus, symbolicus.

Ethpe. οὐδεὶς comparatus est, assimilatus est, se comparavit, c. 5; in fabulis traditus est.

Pa. ﴿ ﻻـ ﺔـ ﻢـ ﻭ ﴿ ﻻـ ﺔـ ﺪـ ﻡـ ﻭ ﴿ ﻻـ ﺔـ ﺪـ ﻡـ ﻭ , *assimilatus*; *figuratus, allegoricus*.

Ethpa. **Ἄλι** similis factus est; repræsentavit, c. 5.

Aph.  parabolam propositum; comparavit, assimilavit; fabulas dixit.

الْأَلْجُورِيَّةُ allegoria.

مَهْلَأ, *heb.* בְּשֵׁל et ar. مَهْلَل, parabola, proverbium; fabula.

parabolicus,
allegoricus.

allegorice.

أَعْلَمُ بِالْأَنْوَافِ Proverbiorum libri
auctor.

ଫୁଲମୂଳୀ figuratus.

figuratio, typi status.

வட்ட, *infinit. v.* வட்ட,

ዕስኩ perpetuus , cfr.
 heb. בָּשָׂר, ar. بَشَّرَ, perfectus
 est, absolutus est, inde pers-
 tans fuit ; pler. adverbial. un-
 quam, aliquando. አውሮም ብ vel

لِمْ مُعَذَّبٌ نَّعْنَعْمَانٌ. لِمْ مُعَذَّبٌ حَدَّتْتَ مَنْ مُعَذَّبٌ annon legistis unquam in Scripturis ?
 لِمْ مُعَذَّبٌ مُّنْ ab æterno, semper ; لِمْ مُعَذَّبٌ id.

ମୁହଁମୁଦ୍ରା æterne.

እዚህንም አተርናስ.

اَئْتُنَّا مُهَمَّدٌ aeternitas; :

doctrinæ; scientia *geometrice*.

docte, mathema-
tice.

մաթեմատիկոս, mathematicus, doctus in geometria.

4

حَمْل *inus.* in *Pe.*; *cfr.* *ar.*
، *مَهْنَانْ* ، *commoratus est*, *et مَهْنَنْ* ،
robustus fuit.

Ethpa. ~~كَوْلِي~~ moratus est,
lentus fuit.

Aph. **جَهْدٌ** retardavit ;
جَهْدٌ مُّتَوَسِّطٌ protraxisti
 jejunium tuum.

تَرْدٌ، تَرْدَةٌ tardus, piger;

hebes, incuriosus ; placidus ;	<i>Pa.</i> מְבָשֵׁס exsuxit.
مَدْنَى مَدْنَى vinum lene.	<i>Aph.</i> מְבָשֵׁס sugere fecit.
مَدْنَى مَدْنَى tarde, segniter.	مَدْنَى مَدْنَى suctio.
مَدْنَى مَدْنَى tarditas, segnities ;	مَادְנָה exsugens.
lenitas.	
לְמִלְמָה , pl. לְמִלְמָה , heb. מִלְמָה et ar. مَثْنَة , lumbi ; trop. dorsum, jugum.	لِمُلְמָה vel לְמִלְמָה et لְמִלְמָה rutabulum furni ; verum ferreum quo assantur carnes.
לְמִלְמָה , id. q. מִלְמָה .	לְמִלְמָה et melius לְמִלְמָה , μετρητής , pl. מִלְמָה , מִלְמָה batus, mensura liquidorum.
טְמַחַת , fut. מְמַחַת , exsuxit ;	לְמִלְמָה dim. præc.
hausit.	לְמִלְמָה et deriv. v. s. לְמִלְמָה .
Ethpe. מְמַלֵּל pass.	

س seu س, decima quarta litera alphabeti Syrorum; numero valet: 50; س = 500, س = 500000, س = quinquagesimus. Respondeat heb.: et ar. س. Permutat:

1º c. heb. ס et ar. ס in terminat. plur.; cfr. מְלָכִים et מֶלֶךְ reges, סְרִיגִים et סְרִיגִים occiditis, סַע et סַע si.

2º c. ס, et viceversa: cfr. سֵבֶת et סֵבֶת ortus est sol, سֵבֶת, ar. سَبَّابَةَ filius.

3º c. ס, et viceversa; targ. מְרִגְלִתָה margarita. سְבִיבָה et سְבִיבָה dabit; سְבִיבָה et سְבִיבָה impius.

4º Ponitur pro heb. ס et ar. س in præfixis futuri; cfr. سְמִמָה, يְקַשֵּׁל occidit; cfr. etiam سְסִפְתָה discaleavit, et heb. سְסִפְתָה discaleatus; it. permutatur c. س; cfr. سְמִמָה et سְמִמָה infra.

5º Præformativa vel afformativa est, non radicalis, v. g.: سَهْدَهْدَهْ cacumen arboris a rad. سَهْدَهْ; سَهْدَهْ, ar. سَهْدَهْ plaga.

6º Est pronomen suffix. 1º pers. pl. in verbis, nomin. et conjunct. : سَهْدَهْ occidimus, سَهْدَهْ Deus noster, سَهْدَهْ a nobis; it. ipsum pron. efformat ut سَهْدَهْ ego.

7º Est signum pluralis numeri in flexione verbi سَهْدَهْ scribitis, et in nomin. سَهْدَهْ reges.

8º Tandem sœpe assimilatur litteræ sequenti, vel omittitur: سَهْدَهْ, zebatto tempus; سَهْدَهْ, ar. سَهْدَهْ vitis; سَهْدَهْ pro سَهْدَهْ a rad. سَهْدَهْ; in compos. سَهْدَهْ, a سَهْدَهْ statim, etc.

سَهْدَهْ ad litteram س pertinens; primam radicalem س habens verbum.

سَهْدَهْ vel سَهْدَهْ, heb. سَهْدَهْ, quæso, age; cfr. سَهْدَهْ et næ.

سَهْدَهْ, heb. سَهْدَهْ et سَهْدَهْ, decuit; Part. سَهْدَهْ, سَهْدَهْ; cfr. سَهْدَهْ, سَهْدَهْ.

سَهْدَهْ mensura liquidorum; cfr. heb. سَهْدَهْ, lagena.

سَهْدَهْ, chald. سَهْدَهْ caminus ignis, prunæ.

بَحْرٌ et بَحْرٌ, id. q. بَحْرٌ, q. videoas.

بَحْرٌ نَّوْمَنْتَى نَّوْمَنْيَى, neomenia, novilunium.

بَحْرٌ نَّخْرَسُ, templi sectio (gall. nef); templum; it. novus, gr. νέος; it. v. s. تَسْمَهُ.

بَحْرَهُ, v. s. بَحْرٌ.

بَحْرَهُ نَّخْرَلَجَرَوْسُ, nauclerus.

بَحْرٌ, fut. v. بَحْرٌ, et v. بَحْرٌ, pro بَحْرٌ. بَحْرٌ et بَحْرٌ, v. s. بَحْرٌ.

بَحْرَهُ تَسْتَرْهُ, texture.

بَحْرَهُ, fut. v. بَحْرٌ.

بَحْرَهُ, 3^a pers. pl. fut. Pa. v. بَحْرَهُ.

بَحْرَهُ نَّافَهُ, sinapi.

بَحْرَهُ نَّافَهُ نَّافَهُ, nephritis, renum morbus.

بَحْرَهُ, fut. Aph. v. بَحْرٌ.

بَحْرَهُ, fut. Pe. v. بَحْرٌ.

بَحْرَهُ, fut. v. بَحْرٌ.

بَحْرَهُ, fut. v. بَحْرٌ.

بَحْرَهُ, v. s. بَحْرٌ.

بَحْرَهُ vel بَحْرَهُ c., بَحْرَهُ, nardus.

بَحْرَهُ امْهَمَهُ نَّافَهُ نَّافَهُ نَّافَهُ, spica nardi.

بَحْرَهُ نَّافَهُونَ (ελαῖον) unguentum e nardo conflatum.

بَحْرَهُ نَّافَهُ, torpedo piscis electricus (gall. torpille).

بَحْرَهُ et بَحْرَهُ نَّافَهُ narcissus. بَحْرَهُ نَّافَهُ, نَّافَهُ, نَّافَهُ.

et نَّافَهُ نَّافَهُ, ferula arbusecula.

بَحْرٌ inus.; cfr. ar. بَحْرٌ elatus est, apparuit res, et بَحْرٌ nuntius, it. بَحْرٌ scaturivit fons absconditus.

بَحْرٌ vaticinatus est, futurum annuntiavit.

Ethpa. بَحْرٌ, ar. بَحْرٌ, vaticinatus est, officio prophetæ functus est, prophetavit; unq. instinctu diabolico prædixit; seq. بَحْرٌ falsa propheta-vit; c. بَحْرٌ prophetavit de.

بَحْرٌ, heb. נְבִיא, ar. بَحْرٌ, pl.

بَحْرٌ, st. c. بَحْرٌ prophetæ, vates; interpres Scripturæ in ecclesiis; poeta.

بَحْرٌ et بَحْرٌ prophetissa.

بَحْرٌ prophetice.

بَحْرٌ, pl. بَحْرٌ, بَحْرٌ, vaticinium, prophetia, munus prophetæ; adv. بَحْرٌ prophetice, juxta prophetiam.

بَحْرٌ, pl. بَحْرٌ, f. بَحْرٌ, pl. بَحْرٌ propheticus.

بَحْرٌ prophetiæ dono instructus.

بَحْرٌ prophetico afflatus.

بَحْرٌ, pl. بَحْرٌ lens, lentes capitis.

نَحْرٌ, fut. نَجَّرَ erupt,
scaturivit ; emersit, germinavit, prodiit ; cfr. نَخْرَ et
ar. نَبَّهَ et بَنَّهَ id.

Ethpa. نَخْرَلَ dimanavit.

Aph. نَخْرَ emanare, scaturire fecit, germinare fecit. Part. pass. مَنْخُرَ, مَنْخُرَاً ; f. emph. مَنْخُرَةً, st. c. مَنْخُرَةً.

نَخْرَ emersio, emanatio, scatbra.

نَخْرَ surculus, germen ; scatbra, fons.

نَخْرَتْنَا derivativus ; gramm. non radicalis ; secundarius, de pronomine, adjectivo, præpositionibus et adverbii.

نَخْرَ et نَخْرَمَا ut نَخْرَ . نَخْرَ arbor cui grana sunt nucleis cerasi similia ; ipsa grana.

نَخْبَنَا, ar. نَبِيَّنَا, liquor ex dactyli vel uvis passis parasitus.

نَخْرَ, fut. نَخَّهَ et نَخَّهَ se movit ; emanavit, processit, ortus est ; trop. emersit, liber evasit ; نَخَّهَ in mentem meam occurrit. نَخَّهَ حَسَبَهُما gaudio motus est. Part. act. نَعْمَلَ دَبَبْ نَخَّهَا ; نَخَّهَا, نَخَّهَ

anima vigilans ; cfr. ar. نَبَّهَ, evigilavit.

Aph. نَخَّهَ movere fecit, excitavit.

نَخْرَ motio. نَخْرَ كَحْلَ motio seu cogitationes mentis. نَخْرَ مَسْنَانَ animalis : vita sensitiva.

نَخْرَ motus, motio ; initium motus, motio ; germen.

نَخْرَتْنَا motu præditus, activus. مَنْخَنَةً nomen actionis.

نَخَّهَ Mercurius nom. pr. et planeta.

نَخَّهَ et نَخَّهَ vermis species, polypodium vulgare ; it. proboscis, pro نَخَّهَ.

نَخَّسَ, fut. نَخَّهَ et نَخَّهَ latravit.

Aph. نَخَّهَ latrare fecit, ad latrandum compulit.

نَخَّسَ latratus.

نَخَّهَتْنَا latrans, latrator.

نَخَّهَتْنَا et نَخَّهَتْنَا مَحَسَّنَا latratus.

نَخَّهَتْنَا, id. q. نَخَّهَ, nauta.

نَخَّهَ nom. propr. Nabal ; it. ignavus ; stultus.

Pa. نَخَّهَ v. denom., convitiis affecit, contempsit.

نَخَّهَ لَهْلَلَهْ et نَخَّهَ لَهْلَلَهْ heb. נָבָלָה, nebel

seu instrumentum musicum apud Hebreos.

نَحْمَأْ pallium *Philosophorum* ;
cfr. ἀναβολή et ἀναβληθόν.

نَحْمَأْ , fut. نَحْمَأْ , heb. נַחֲמָה et ar. نَجَّمَ , saliit, scaturivit *aqua* ; trop. erupit, repente apparuit; c. نَحْمَأْ emanavit, ortus est, prodiit, c. نَجَّ ; adortus est, c. نَجَّ . نَحْمَأْ بِمَسْتَأْ floruit tempore Graecorum.
Part. act. نَحْمَأْ .

Ethpa. نَحْمَأْ scaturivit.

Aph. نَحْمَأْ scaturire fecit, erumpere fecit; pullulare fecit, protulit; evulgavit, excoigitavit *doctrinas novas*. نَحْمَأْ e suo penu confinxit. أَدَدْ سُتْمَأْ contentiones movit.

نَحْمَأْ , fons, scaturigo, caput fluvii.

نَحْمَأْ ortus, emanatio.

نَحْمَأْ ut نَحْمَأْ .

نَحْمَأْ مَحْمَأْ , pl. مَحْمَأْ fons, scaturigo, ar. نَجَّب . نَجَّب fontes abyssi. إِلْقَأْ مَحْمَأْ mysteria salutis principium.

نَحْمَأْ id.

نَحْمَأْ scaturire faciens; inventor *haeresium*.

نَحْمَأْ مَحْمَأْ et مَحْمَأْ effusio, emanatio, productio.

نَحْمَأْ , al. نَحْمَأْ , ar. نَجَّ , lotus, fructus loti.

نَحْمَأْ , fut. نَحْمَأْ unguibus rimatus est, eruit, effodit ;

cfr. ar. نَجَّ , elevavit, extulit.

نَحْمَأْ . نَحْمَأْ

نَحْمَأْ fissio; fibræ palmarum; juncus; it. ut seq.

نَحْمَأْ unguis aduncus accipitris, etc.; calcar galli.

نَحْمَأْ نَحْمَأْ rostrum, proboscis.

نَحْمَأْ نَحْمَأْ pers. نَجَّرِيَة et ar. نَجَّرِيَة , aries castratus.

نَحْمَأْ inflammavit.

Ethpa. نَحْمَأْ pass. ; arsit ; دَكْ كَهْ حَمْعَدَأْ وَلَانَحْمَأْ cohíbe iram tuam ne ardeat.

نَحْمَأْ ignis, flamma; candelabrum; *cfr. ar.* نَيزَاس lucerna.

نَحْمَأْ نَحْمَأْ igneus, flammeus.

نَحْمَأْ نَحْمَأْ inflammatio; trop. splendor.

نَحْمَأْ نَحْمَأْ urens, accendens.

نَحْمَأْ نَحْمَأْ adustio, inflammatio.

نَحْمَأْ نَحْمَأْ inus. ; *cfr. ar.* نَبَش , effodit.

نَحْمَأْ نَحْمَأْ effosso sepulchrorum.

نَحْمَأْ نَحْمَأْ effossio sepulchrorum.

بَحْمَةٌ avis aquatica, otis.

نُحْمَةٌ, pers. نوشته epistola.

سَجَقٌ, fut. سَجَقَ et سَجَقٌ aruit, exsiccatus est; cfr. ar. شَفَقَ, شَبَقَ id.

Pa. سَجَقٌ arefecit, exsiccavit.
Part. pass. سَجَقٌ, سَجَقٌ; subst. paralyticus.

Ethpa. سَجَقَلٌ pass.

Aph. سَجَقَلٌ exsiccavit.

سَجَقَةٌ exsiccatio.

سَجَقَهٌ, heb. سَجَقَهٌ, Austrum, meridies.

سَجَقٌ siccus, aridus; marcidus.

سَجَقَهٌ sicce.

سَجَقَهٌ exsiccatio; ariditas.

سَجَقَهٌ laxitas membrorum ex morbo.

سَجَقَهٌ exsiccans; siccus, aridus.

سَجَقَهٌ exsiccatio.

سَجَقَهٌ museum odoramentum.

سَجَقَ, fut. سَجَقَ adduxit.

Ethpe. سَجَقَلٌ pass.

سَجَقَ, fut. سَجَقَ, imper. سَجَقَ, infin. سَجَقَ, traxit, duxit; metallum in laminas conver-

tit; adduxit, c. لَدَّ ; attraxit; subtraxit; c. نَقَعَ, nnq. absol. se subduxit; tetendit arcum; se extendit; gramm. produxit litteram; سَجَقَ لَدَّ eos ad haeresim seduxit. مَهْوَى مَهْوَى moenia extulit.

أَيَا تَاهَ eia age! eamus!
Part. act. سَجَقَ, سَجَقَ; سَجَقَ دَهْنَدَ equus citato cursu currens ad praelium; سَجَقَاتْ لَاجِنَاتْ ad exitum trahentes. **Part. pass.** سَجَقَ, سَجَقَ; **act.** trahens.

Ethpe. سَجَقَلٌ pass.; trop. prolixus fuit.

Pa. سَجَقَ traxit; flagellavit, percussit; trop. afilixit. سَجَقَ اجْتَرَقَنَا Ægyptios plagiis affecit Moyses. سَجَقَ وَهَدَّ graves ei poenas inflixit.

Ethpa. سَجَقَلٌ pass. سَجَقَلٌ سَجَقَلٌ vi coactus crimen confessus est.

Aph. سَجَقَ attraxit; fugit.

سَجَقَ tractio; plaga, flagellatio; tormentum, supplicium, poena; flagellum, virga.

سَجَقَ ductio, tractio, attractio.

سَجَقَ ductor; retinaculum jugi; gramm. ductor pronunciationis seu lineola oblique superposita ultimæ lit-

terce quiescenti vocis, quando ipsa vox immediate sequens quiescente incipit, cuius linelæ finis est productio syllabæ, ex.: وَمَحْدَى دَنْ دَنْ filius regis.

لَوْمَهْدَى، ut لَوْمَهْدَى.

لَوْمَهْدَى، al. وَبِهِمْدَى calix; baculus aduncus quo lusoria pila impellitur.

لَوْمَهْدَى dux, ductor.

لَوْمَهْدَى tractu, tractione.

لَوْمَهْدَى prolongatio; pertractione.

لَوْمَهْدَى hymni species, tractus.

لَوْمَهْدَى flagellator; scutica.

لَوْمَهْدَى flagellans, flagellator.

لَوْمَهْدَى flagellis cæsus.

لَوْمَهْدَى, heb. نَهَى, fut. لَوْمَهْدَى, illuxit sol, dies; impers. لَوْمَهْدَى illucescit dies; لَوْمَهْدَى proximum est ut lux oriatur. Part. præs. لَوْمَهْدَى, لَوْمَهْدَى; لَوْمَهْدَى سَعَدَا حَمَّادَا illucescente feria quinta; subst. lux imperfecta, inde crepusculum, diei aurora, diluculum; Vesperæ primæ divini Officii.

Aph. لَوْمَهْدَى luxit; usque ad auroram vigilavit, pernoctavit. Part. præs. لَوْمَهْدَى, emph. لَوْمَهْدَى.

لَوْمَهْدَى, spec. usitat. in pl. لَوْمَهْدَى, st. c. لَوْمَهْدَى, mane, diluculum; it. initium diei ecclesiastici incipiens post solis occasum diei præc. (id. ac مَهْدَى مَهْدَى مَهْدَى مَهْدَى illucescente Dominica seu Vesperæ Dominicæ. لَوْمَهْدَى مَهْدَى sub auroram.

لَوْمَهْدَى aurora, diluculum; فَعَدَتْ لَوْمَهْدَى Lucifer stella.

لَوْمَهْدَى matutinus.

لَوْمَهْدَى flagellum.

لَوْمَهْدَى veru intortum.

لَوْمَهْدَى, fut. لَوْمَهْدَى recessit, fugit; cfr. ar. نَجَلَ, citius abiit.

Pa. لَوْمَهْدَى id.

Aph. لَوْمَهْدَى abstersit, mundavit; cfr. ar. نَجَلَ abstersit scripturam; it. Aph. v. لَوْمَهْدَى. Part. act. لَوْمَهْدَى, مَهْدَى; trop. مَهْدَى حَمَّادَا muros destruebat.

لَوْمَهْدَى spurcus, immundus; cfr. ar. نَجَلَ, corruptus est, et نَفَلَ illegitimus filius.

لَوْمَهْدَى immundities.

لَوْمَهْدَى, emph. لَوْمَهْدَى et لَوْمَهْدَى, pl. لَوْمَهْدَى, heb. نَجَلَ, ar. نَجَلَ, falx.

لَوْمَهْدَى, fut. لَوْمَهْدَى consedit.

لُجْدَنْ locus depressus; *cfr.* نُحْمَدْ, *talmud.* نَكْنَتْ et ar. نَقْشْ; it. foramen.

لُجْدَنْ, fut. لُجْدَنْ prolongatus est, protractus est, duravit; *cfr.* ar. جَرَّ, traxit, prolongatus est; آمَدْ فَعْلَهْ وَنَكْنَتْ أَمَدْ لُجْدَنْ temporis successu continuo; it. ar. تَجَرَّ, dolavit. fabricavit; *trop.* confinxit. Part. pass. act. لُجْدَنْ, نَكْنَتْ; subst. tornator, faber.

Pa. لُجْدَنْ fabrefecit, dolavit, asciavit; *trop.* correxit, repressit.

Aph. لُجْدَنْ prolongavit, protractit; seq. مَكْلَمَةْ مُدَمَّدَهْ prolongavit dies suos, *inde abs.* diu vixit; seq. مَوْسَهْ vel لُجْدَنْ longanimem, patientem se præbuit; dilationem, moram concessit, c. لُجْدَنْ, vel لُجْدَنْ pers. aut etiam *absol.*; it. ut Pe. prolongatus est, duravit, moratus est; exspectavit, perseveravit; commoratus est. لُجْدَنْ

لُجْدَنْ مَكْلَمَهْ مُهَمَّهْ perseveravit in oratione. Part. act. et pass. لُجْدَنْ vel لُجْدَنْ, نَكْنَتْ, f. emph. لِجْدَنْ; subst. in st. c. f. cum مَوْسَهْ patientia, longanimitas; adverb. c. لُجْدَنْ patienter.

لُجْدَنْ patientia.

لُجْدَنْ spatum, diurnitas post longum temporis spatium; adverb. c. لُجْدَنْ, لُجْدَنْ, مَنْ, nnq. absol. s. *præp.*, diu, a longo tempore; it. لُجْدَنْ sero; raro.

لُجْدَنْ secans, dolator.

لُجْدَنْ, نَكْنَتْ longus, diurnus; tardus; seq. مَوْسَهْ patiens, longanimis. لُجْدَنْ اَطْهَرْ aeternus. لِجْدَنْ مَهْمَهْ longævi homines. لِجْدَنْ مَهْمَهْ مَهْمَهْ viæ longinque. لُجْدَنْ lentus ignis.

لُجْدَنْ patienter, diu. لُجْدَنْ مَهْمَهْ multum defatigatus est.

لُجْدَنْ diurnitas; لُجْدَنْ مَكْلَمَهْ longitudo dierum.

لُجْدَنْ لُجْدَنْ patientia, perseverantia.

لُجْدَنْ, نَكْنَتْ, ar. تَجَارْ, lignarius faber.

لُجْدَنْ ars fabri lignarii, fabrica.

لِجْدَنْ secundum artem fabri.

لِجْدَنْ, ar. سَنْ, passer domesticus.

لُجْدَنْ patiens.

لُجْدَنْ patientia; dilatio, mora; *cfr.* Aph.

تَهْجِه teges, umbraculum storieis confectum *in parvis naviculis*, *ar.* مَنْجُور ligneis tabulis fabricatus *locus*.

أَبْرَع, fut. تَبَرَّع, stillavit, effluxit, *cfr. ar.* هَدِي humidus fuit, *et* هَدِي ros; erupit; prominuit, protumuit, *ar.* هَمْ id. Part. præs. تَبَرَّع, tumidus.

Pa. هَرْبَرَع erumpere fecit, commovit; aspersit. Part. act. هَرْبَرَعًا, هَرْبَرَعاً. Part. pass. هَرْبَرَعْ, هَرْبَرَعْ erumpens, prosiliens; adj. vagabundus, *cfr.* heb. נָדַר erravit.

تَبَرْعَة et تَبَرْعَة prominentia, tumor, pustula; eruptio.

تَبَرْعَة id.; haemorrhoides.

أَبْرَعَة, fut. تَبَرَّع abominatus est, abhorruit, *c. مَهْ*; تَهْمَهْ fastidivit anima ejus, *inde impers.* كُلْكَلْتَهْ, abhorruui, abhorruisti, *etc.*, fut. أَبْرَعَة abhorreo; *cfr.* تَهْمَهْ; it. vacillavit: لَهْلَهْ مَهْ مَهْ أَهْ tremuerunt et vacillaverunt ut ebrii. لَهْلَهْ مَهْ تَهْ e somno excitatus est. Part. act. præs. تَهْلَهْ, تَهْلَهْ; لَهْلَهْ مَهْ تَهْ abhorrebat. Part.

pass. بَهْمَهْ, بَهْمَهْ, abominandus, horrendus, immundus, turpis: بَهْمَهْ وَسْلَا male olens. مَهْمَهْ مَهْمَهْ بَهْمَهْ cibi impuri, vetiti.

Ethpe. بَهْلَهْ et بَهْلَهْ contaminatus est; abhorruit.

Pa. بَهْلَهْ ut Pe.; abominabilem reddidit.

Ethpa. بَهْلَهْ horrori factus est; abhorruit.

Aph. بَهْلَهْ excitavit, abegit; *cfr.* بَهْلَهْ, s. بَهْلَهْ; nauseam movit; abhorruit. Part. act. هَمْ, هَمْ. Part. pass. هَمْ, هَمْ. abominationi habitus; subst. abominatio.

Ethpalp., بَهْلَهْ abominatus est. بَهْلَهْ abominatio; fastidium, odium.

بَهْلَهْ ut بَهْلَهْ millepeda. بَهْلَهْ turpiter.

بَهْلَهْ, pl. لَهْلَهْ بَهْلَهْ abominatio, turpitudo, sordes; flagitium, vitia.

بَهْلَهْ et بَهْلَهْ مَهْ مَهْ concitatio, exagitatio.

بَهْلَهْ, fut. لَهْلَهْ commovit, excitavit.

بَهْلَهْ commotio; it. ut seq.

بَهْلَهْ mus campestris; millepeda; *cfr.* بَهْلَهْ.

۱۰۰۲ et **۱۰۰۳**, fut. **۱۰۰۴**,

altius ingemuit, cfr. ar. **۱۰۰۵** et **۱۰۰۶**, it. heb. **۱۰۰۷** et **۱۰۰۸**, rugiit, fremuit, ululavit; trop. dure increpavit, cfr. ar. **۱۰۰۹**, camelos clamore excitavit.

Pa. **۱۰۰۱** id.

Ethpa. **۱۰۰۱** rugiit, fremuit.

۱۰۰۲ rugitus, fremitus.

۱۰۰۳ gemitus.

۱۰۰۴, et in poesi **۱۰۰۵**, st.

c. **۱۰۰۶**, pl. **۱۰۰۷** rugitus, fremitus, ululatus, gemitus; c. aff. **۱۰۰۸**, **۱۰۰۹**.

۱۰۰۱ rugiens; gemebundus.

۱۰۰۲, ut **۱۰۰۳**.

۱۰۰۳ gemebundus.

۱۰۰۴ crocodilus.

۱۰۰۱ inus.; cfr. ar. **۱۰۰۲** et **۱۰۰۳** momordit serpens, it. **۱۰۰۴** serpens.

۱۰۰۵ morsus.

۱۰۰۶ **۱۰۰۷** **۱۰۰۸**, nubes; argentum vivum *apud alchim.*

۱۰۰۹ **۱۰۰۱۰** **۱۰۰۱۱**, nubecula.

۱۰۰۱۲, pl. **۱۰۰۱۳** **۱۰۰۱۴**, ren.

۱۰۰۱۵ **۱۰۰۱۶**, renum morbus.

۱۰۰۱۷ **۱۰۰۱۸**, mortuus.

۱۰۰۱, fut. **۱۰۰۲**, imp. **۱۰۰۳**

illuxit, fulsit; mane fuit; arsat; trop. illuminatus est vera fide. Part. præs. **۱۰۰۴**, **۱۰۰۵** **۱۰۰۶**; **۱۰۰۷** die sabbati in dominicam vergente seu in primis vesperis diei dominicæ; cfr. heb. **۱۰۰۸**, et ar. **۱۰۰۹** dies, it. cfr. **۱۰۰۱۰** ignis.

Ethpe. **۱۰۰۱۱** illuminatus est.

Pa. **۱۰۰۱۲** illuminavit, illustravit; elucidavit, explanavit; ornavit; it. *denom. a ۱۰۰۱۳* fluxit.

Ethpa. **۱۰۰۱۱** pass.; trop. Fide vel Baptismo insignitus est

Aph. **۱۰۰۱۲** illuxit, fulsit, splenduit; accedit *luminaria*; illuminavit, elucidavit. **۱۰۰۱۳** **۱۰۰۱۴** **۱۰۰۱۵** **۱۰۰۱۶** **۱۰۰۱۷** splendere fac vultum tuum super sanctuarium tuum: benigno vultu respice eum.

Ettaph. **۱۰۰۱۱** illuminatus est.

۱۰۰۱۸ et **۱۰۰۱۹**, emph. **۱۰۰۲۰** et usitat. **۱۰۰۲۱**, lux, lumen, luminare; trop. splendor, illuminatio; ingenium, doctrina; vita, ornamentum; successus, felicitas. **۱۰۰۲۲**

- filii lucis**: Justi. حَتَّىٰ شَمْسٌ خَلِيلٌ spiritus lucidi seu Angeli. حَمْدًا وَنَعْمَانٌ Sabbathum Sanctum. فَهَذَا تَهْوِيدٌ stella luminis: Venus; حَلْوَىٰ et abs. إِبْرَاهِيمٌ Epiphaniae festum. حَلْوَىٰ fulgens, splendens. حُلُوقٌ splendor.
- مَبْرُونٌ, f. emph. مُبْرِزٌ splendidus, lucidus; fulgens; trop. illuminatus mente, perspicuus, doctus; clara res; subst. lux, lumen; luminare, candela, stella; orbis; in f. emph. ignis. حَفَّةٌ حَفَّةٌ vultu renidens.
- مَبْرُونٌ lucide, clare, manifeste. حُلُوقٌ splendor, claritas, illuminatio; trop. perspicacitas, intelligentia; it. Celositudo, Sublimitas, titulus honoris.
- حُلُوقٌ dilucidatio.
- حُلُوقٌ splendidus.
- حُلُوقٌ, إِبْرَاهِيمٌ illuminatio; declaratio, interpretatio; commentarius, scholia.
- حُلُوقٌ m., ar. نَهْرٌ et heb. נַהָרָה, pl. حُلُوقٌ, حُلُوقٌ flumen; حَسْنَىٰ حَسْنَىٰ lachrymæ. حَسْنَىٰ حَسْنَىٰ حَسْنَىٰ et حُلُوقٌ حُلُوقٌ Mesopotamia.
- مُنْجَنٌ dimin., rivulus.
- مُنْجَنٌ fluviatilis, flumineus; ad Mesopotamiam pertinens, mesopotamiensis.
- مُنْجَنٌ exponens, dilucidans; commentator.
- مَكْنَقٌ, مَكْنَقٌ illuminans, illuminator; lucidus; subst. fenestra (*gall.* lucarne).
- إِلْهَادٌ et إِلْهَادٌ illumination; explicatio; trop. Baptismus.
- مَكْنَقٌ illuminatus.
- مَكْنَقٌ illuminatio; trop. Baptismus.
- مَكْنَقٌ arum, dracunculus herba (*gall.* estragon).
- مَكْنَقٌ, fut. مَكْنَقٌ circumcidit; cfr ar. نَجَّلَ pellem detraxit.
- Aph. مَكْنَقٌ id. Part. pass. مَكْنَقٌ.
- مَكْنَقٌ, مَكْنَقٌ et مَكْنَقٌ circumcisio.
- مَكْنَقٌ a græco ναυαγίω, naufragio submersit. Part. act. مَكْنَقٌ. Part. pass. مَكْنَقٌ; naufragus.
- Ethpa. مَكْنَقٌ naufragium passus est; fluctibus exagitatedus est.
- مَكْنَقٌ et مَكْنَقٌ naufragus.

لَوْه naufragia, naufragium,
cfr. ar. نَزْجَةٌ procella; trop.
periculum, calamitas; cruciatus.

لَهْلَهْ et لَهْلَهْ, pl.
لَهْلَهْ naufragus; morti
proximus; pl. naufragium,
navis fractæ reliquiae.

لَهْلَهْ naufragium.

لَهْلَهْ, heb. נָרָא, ar. نَرَأَ et لَهْلَهْ,
fut. لَهْلَهْ, commotus est, ex-
citatus est, se movit; tre-
muit sub flatu venti arbor,
etc., oscillavit, vacillavit; pal-
pitavit cor; jactata est na-
vis, etc.; circumvagatus est;
trepidavit, horruxit; aufugit;
cfr. بَرَّ. أَنْدَادُ وَبَرَّ exsiluit
e suo loco. Part. præs. لَهْلَهْ,
لَهْلَهْ.

Ethpa. لَهْلَهْ commotus est.
Aph. لَهْلَهْ commovit, agitavit,
movit caput, etc; excitavit,
terruit, tremere fecit.

Ethpalp. لَهْلَهْ commotus est.
لَهْلَهْ et لَهْلَهْ motio, motus; com-
motio; terræmotus; trop. لَهْلَهْ
لَهْلَهْ, motio capitis: ludibrium,
irrisio.

لَهْلَهْ motus; terræmotus.

لَهْلَهْ, fut. لَهْلَهْ calcitravit.

لَهْلَهْ et لَهْلَهْ calcitratio; demen-
tia.

لَهْلَهْ calcitrans; demens, dæ-
moniacus.

لَهْلَهْ, fut. لَهْلَهْ quievit;
cessavit, desiit; cfr. heb. נָשַׁם
id., et ar. نَمَّ commoratus est.
لَهْلَهْ,
لَهْلَهْ, adj.
usurp. quietus, mitis, placi-
dus; gratus; لَهْلَهْ mare tranquillum; gramm.
lenis littera. لَهْلَهْ mulier beate quiescens in
Domino. لَهْلَهْ quietus
quoad animam: defunctus.

Ethpe. لَهْلَهْ, et minus recte
لَهْلَهْ, requievit; subsedit,
cessavit ira; c. لَهْلَهْ, insti-
tit, incubuit in aliquem ma-
lum; confusus est in opibus;
c. لَهْلَهْ, liberatus est, destitut
a re; c. لَهْلَهْ acquievit, oblec-
tatus est, fruitus est; trop.
mortuus est.

Pa. لَهْلَهْ requiescere fecit,
pacavit.

Aph. لَهْلَهْ requiem dedit, re-
quiescere fecit; depositus onus,
arma; quietum, contentum
reddidit, placavit, satisfecit;
placuit, coluit c. acc. vel لَهْلَهْ

pers. ; *c.* نَهْ *pers.* imposuit, oneravit ; *intrans.* contentus fuit ; se complacuit. *Part. act.* مَهْمَسْ , مَهْمَسْ ; مَهْمَسْ لَكْدَنْ vacantes Deo : monachi. *Part. pass.* مَهْمَسْ , مَهْمَسْ , quietus, pacate vivens, contentus; *c.* حَفِظْ fruens; grata res; *trop.*, defunctus. مَهْمَسْ volebat. مَهْمَسْ مَهْمَسْ , pro requies, pacatio. مَهْمَسْ مَهْمَسْ si tibi placet. مَهْمَسْ لا مَهْمَسْ noluit. مَهْمَسْ قُبْحَهْ مَهْمَسْ وَمَهْمَسْ quod ipsi placebat eis præcipiens.

نَهْ مَهْمَسْ نَهْ quies, tranquillitas ; locus quietis. نَهْ مَهْمَسْ نَهْ quies, tranquillitas ; cessatio, allevatio oneris ; placatio, satisfactio, placitum ; oblectamentum, suavitas, voluptas ; مَهْمَسْ وَمَهْمَسْ benevolentia regis seu rex benevolus; *adv.* حَنْسْ quiete ; sine labore. مَهْمَسْ وَمَهْمَسْ , homo pacificus. مَهْمَسْ نَهْ مَهْمَسْ si tibi placet, sodes.

نَهْمَهْ tranquille, quiete ; leniter, facile ; paulatim. نَهْمَهْ نَهْمَهْ quies, tranquillitas ; suavitas, mansuetudo ; Serenitas, *titulus honoris* ; *adverb.* *c.* حَفِظْ , benigne.

نَهْمَهْ requies, pax ; vacatio,

otium, *c. suff.* مَهْمَسْ , مَهْمَسْ etc.; *trop.* obitus *præs. Beatorum*; otium Christi seu octava Paschatis, festa Paschalia ; agape *pro requie defunctorum*; *cfr. neo-ar.* زَيَّاجَةٌ edulia a sacerdote benedicta et fidelibus distributa pro pace defuncti.

نَهْمَهْ requies, pacatio. مَهْمَسْ مَهْمَسْ benevolentia, beneplacitum.

نَهْمَهْ requiescere faciens, satisfaciens ; ministrans, minister, cultor ; asceta, monachus ; accentus nomen quo tristis animi sensus exprimebatur.

نَهْمَهْ مَهْمَسْ مَهْمَسْ pl. مَهْمَسْ مَهْمَسْ satisfactio ; ministerium, obsequium ; *it.* motus in metro poetico.

نَهْمَهْ مَهْمَسْ مَهْمَسْ ministerialis. مَهْمَسْ مَهْمَسْ مَهْمَسْ quiete fruens. مَهْمَسْ مَهْمَسْ مَهْمَسْ requies.

نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ pl. نَهْمَهْ نَهْمَهْ etc. نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ nauta.

نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ humiditas. مَهْمَسْ نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ notus austri ventus.

نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ نَهْمَهْ et نَهْمَهْ نَهْمَهْ vox lat.,

notarius, scriba publicus.
אַנְחָרוֹתִית ἀναχρωρητής, anachoreta.

אַנְחָרוֹטִיכָה vita anachoretica.

אַרְנֵה, **תֵּלָה**, ar., jugum textoris; tela aranæ. **אַרְנֵת** vita textura.

אַרְנְטוּרִיָּה textorius.

אַרְנֵב et **אַרְנֵבָה** incubo.

אַרְנֵת denom., afflixit, exagitavit, excruciavit. Part. pass. **אַרְנֵת**, **מְהֻנָּה**, f. emph. **אַרְנֵת** graviter aegrotans.

Ethpa. **אַרְנֵתְלִי** pass.; **אַרְנֵתְלִיְהַ** **אַרְנֵתְלִיְהַ** morbo laboravit.

אַרְנוֹת morbus continuus, diuturnus; miseria.

אַרְנוֹתָה *id.*

אַרְנוֹתָה et **אַרְנוֹתָה** morbus diuturnus; infirmitas.

אַרְנוֹתָה excrucians.

אַרְנוֹתָה, heb. אַרְנוֹת, ar. نَامَ, fut. **אַרְנוֹתָה** dormivit. Part. præs. **אַרְנוֹתָה**, **נָסְמָה**.

Pa. **אַרְנוֹתָה** dormire fecit, sopivit.

Aph. **אַרְנוֹתָה** *id.*

אַרְנוֹתָה emph. **אַרְנוֹתָה**, pl. **אַרְנוֹתָה** somnus, dormitio.

אַרְנוֹתָה dormiens.

אַרְנוֹתָה somno mersus.

אַרְנוֹתָה, **אַרְנוֹתָה** et **אַרְנוֹתָה** f., pl.

אַרְנוֹתָה et **אַרְנוֹתָה** νομή, pastio, pabulum, pascua; ulcus; it. νομός distributio; fines; possessio, usufructus; **אַרְנוֹתָה** serpsit *ulcus*, trop. se exten- dit res; **אַרְנוֹתָה** distributio aquæ; *in pl.* **אַרְנוֹתָה** νοῦσυμος, nummus.

אַרְנוֹתָה et **אַרְנוֹתָה** νομικός, legis- peritus; scriba.

אַרְנוֹתָה ad scribam *vel* ejus of- ficium spectans.

אַרְנוֹתָה legisperiti officium; actorum publicorum scriptio.

אַרְנוֹתָה νεομηνία, novilunium. **אַרְנוֹתָה** et **אַרְנוֹתָה** νυμφώια, lotus, nymphæa (*gall.* néu- far).

אַרְנוֹתָה, vox lat., numerus, turma militaris.

אַרְנוֹתָה, pl. **אַרְנוֹתָה** et **אַרְנוֹתָה**, pisces, cete; it. *in pl.* signum Zodia- ci; cfr. ar. ئېنەن id.

אַרְנוֹתָה dimin., piseculus. **אַרְנוֹתָה** et **אַרְנוֹתָה** Nonæ seu 5^a aut 7^a dies mensis romani.

אַרְנוֹתָה, fut. **אַרְנוֹתָה**, tremuit; cfr. ar. ئاسى motus est.

Pa. **אַרְנוֹתָה** lucrari fecit, acqui- rere fecit; cfr. ar. ئاش procuravit.

تَمْتَهْلَمْهَأ tremor.

تَمْبَهْلَمْهَأ *vaxōs*, templum, sanctuarium; spatiū interius templi (*gall. nef*) ; arca seu capsā reliquiarum *Martyrum*; *it.* palatium; camera sepulchralis, cœmeterium, *ar.* تَأْوِيس .

تَمْهَمْهَأ *vōsōs*, morbus.

تَمْهَمْهَأ *aroma*; *palma præcox*; *it. ut* تَمْهَمْهَأ *, pers.* تُورُوز , initium anni apud Persas.

تَمْهَمْهَأ *et* تَمْهَمْهَأ *nomen* primæ Dominicæ aestatis quæ septima est post Pentecosten; anni Persici initium.

تَمْهَمْهَأ *aroma*, thus.

تَمْهَمْهَأ , *fut.* تَمْهَمْهَأ tremuit; *cfr. heb.* נָרַי *et ar.* نَعَ nutavit, libravit.

تَمَّا pectus.

تَمَّا , *fut.* تَمَّا inclinavit se; *trop.* operam navavit; *cfr. heb.* עִזָּה, sursum et deorsum agitavit, *et ar.* ئَاف , incubuit *operi*.

Ethpe. تَمَّا agitatus est, jactatus est.

Ethpa. تَمَّا se inclinavit.

Aph. تَمَّا inclinavit, admovit; vibravit, concussit; *it. pler. c.* حَابِبا manu annuit; *c. تَحْرِي*,

تَمَّا minatus est. تَمَّا oraria sua agitantes.

تَمَّا inclinatio, motus; motus manus, signum; *it. finis*, *cfr. مَخَا*.

تَمَّا inclinatio.

تَمَّا cessans, *v. s.* مَفَأَ .

تَمَّا vibratio, nutus.

تَمَّا , *fut.* تَمَّا prodiit germen, planta; *cfr. ar.* تَوَض germinalit planta.

تَمَّا eruptio germinis; germen. تَمَّا أَخْفَى *uxurālāwψ*, luscitosus.

تَمَّا uncia, *v. تَمَّا*.

تَمَّا *vaxúlārōs*, nauclerus; navis rector.

تَمَّا , *fut.* تَمَّا excitatus est; fugit, aufugit, abhorruit *a*; *cfr. ar.* نَار *et* ئَقَر expavit. *Part. præs.* تَمَّا , *nnq.* تَمَّا . تَمَّا fuga; equi fugacis pavor.

تَمَّا f. , pl. تَمَّا ignis; rogus, caminus ignis; *cfr. تَمَّا* *et ar.* ئَر illuxit, *it.* نَر , lucerna, *et* luxit. حَتَّت حُنَّه تَمَّا pyreus. تَمَّا filii ignis: Angeli. تَمَّا acies gladii. وَسَدَّا

تَمَّا et تَمَّا dim., igniculus.

Pa. $\overleftarrow{\text{v.}}$ *denom., ignem accedit.*

*Ethpa. ةَلِيٌّ et ئَلِيٌّ accensus
est. illuminatus est.*

לִזְבַּח, fut. **לִזְבַּח** se inclina-
vit; descendit, præpondera-
vit *libra*, etc.; cfr. ar. **لَزِبَحْ**
descendit, et heb. **לִזְבַּח** diffluxit,
demisit.

igneus; igneo-
lumini similis; pl. لَهْوَاتٌ
piner album.

Pa. inclinavit, propendere
fecit; adduxit, impulit; *it.*
fut. *Aph.* verbi

La ^{et} ignea substantia.

لُبْدَهُ igneus; *apud geometras,*
conus.

نَوْفِيَّا natura ignea.

speculum.

لِزْوَهْ et لِزْوَهْ, ar. ظُر, flos; foenum.; it. linimentum depilatorium ex calce et arsenico confectum, ar. ظُرَة.

¶^۱ inclinatio stateræ, præpon-
deratio mensuræ. ¶۲ حُدُم
eodem gradu, æqualis.

، مَدْنَارٌ، ar. مَدْنَارَةً، emph. مَدْنَارٍ، st.

c. لَمْدَنْ , pl. مَدْنَةٌ lychnuchus,
candelabrum; turris alta in
templis Moslemorum (gall.
minaret).

لَهْنَةٌ candelabrum.

مُهَبَّةٌ نَّعَماً splendor igneus.

مَهْمَلٌ, *id. q. مَهْمَلٌ*, *pl. نَهْمَلَةً*, *ca-*
pulus, loculus; it., pro **نَعْمَلٌ**,
anima.

نُوشادِر, pers. - ar. sal ammoniacum.

اَلْيَمْ *impersonaliter adhibitum* :
كَمَا تُمْكِنْ me tædet, mihi
dispicet; *cfr.* ar. اَلْيَمْ aufguit.

טָמֵן, *heb.* **נוֹה**, *tugurium.*

الْمُنْكَرِ inclinatio, oscillatio.
الْمُدَانِ dignitas, gradus ; statione
الْمُنْتَهِي lunæ ; cfr. ar. مَنْتَلٌ et مَنْتَلَةٌ .
الْمُكَبِّلِ inclinare faciens.

|අළු, pl |අළු සේරා, dolium

posuit ab usu profano, di-
vino cultui consecravit, inde
continentiam coluit; it. pler.
seq. **نَحْمًا** se abstinuit a, c. **فِنْ**
رَئِي; monachum se fecit; cfr.
بَرْبَرْ. Part. act. **نَسْنَةً**, **نَسْنَةً**.
Part. pass. **نَسْنَةً** separatus;
inde nazaræus; abstinentis,
castus; asceta, monachus.
Ethpe. **نَسْنَةً** se separavit,
se continuit, nazaræum se
fecit; abstinuit.

Pa. ; **L** abstinere fecit ; con-

tinentiae vel religioni aliquem consecravit.

Ethpa. ةَبَاتَهُ se abstinuit; nazareum se fecit.

continentia.

continenter, more ascetarum.

status nazarei, continentia, vita ascetica, monachalis.

acinaces; cfr. نَمْنَاءٌ.

لَسْمَتْ , ar. نَجِنَ , fut. languit, macilentus fuit. Part. præs. لَسْمَتْ . Part. præt. سَخَا macer, languidus.

Ethpe. ةَبَاسَتْ macer fuit, macilentus factus est.

Pa. سَخَتْ emaciavit.

سَخَا macies; scabies.

سَخَا , تَسْخَا macer, tenuis, squalidus.

سَخَمَا macies, squalor.

سَخَا macer.

سَخَا , سَخَمَا macer, tenuis; squalidus.

أَسْخَمَا ut سَخَمَا.

سَخَمَا macies.

سَهْ , fut. سَهَّ stertuit; cfr. ar. نَجَطَ id.

سَهْ id.

سَهْ rhoncus.

مَسْهَنَةٌ et مَسْهَنَةٌ stertens.

لَسْمَهْ , fut. لَسْمَهْ , imp.

لَسْمَهْ et لَسْمَهْ cribravit; effudit; cfr. ar. نَخْلَهُ cribravit et effudit aquas nubes.

Ethpe. لَسْمَهْ pass.

Pa. لَسْمَهْ ut *Pe.*

لَسْمَلْا cribratio; effusio, fluxus.

لَسْمَلْا , st. c. سَلَلْا , heb. נַרְלָה , torrens; vallis.

مَسْلَلْا et مَسْلَلْا , مَسْلَلْا , مَسْلَلْا , pl. مَسْلَلَاتْ , ar. فَنِيلُهُ , cribrum.

لَسْمَهْ inus.; cfr. ar. نَحَرَ anhelavit.

Pa. لَسْمَهْ anhelitum alicui reduxit, inde vivificavit, resuscitavit.

Ethpa. لَسْمَهْ resuscitatus est, revixit; excitatus est e somno.

Aph. سَهَّ resuscitavit.

سَهَّ suscitatio, resurrectio.

سَهَّ resurrectio; trop. restitutio in primo statu.

سَهَّ et سَهَّ resurreccio.

سَهَّ et سَهَّ , ar. نَحَمَ , avis anseri similis, phoenicopterus (gall. flamant).

مَسْهَنَةٌ . مَسْهَنَةٌ , f. emph. مَسْهَنَةٌ مَسْهَنَةٌ suscitor.

| نَسْمَة | مَنْسُكَةً | et مَنْسُكَةً | resusci-
tatio.

| نَسْمَة | , ar. نَفَثَة , isthmus gut-
turis (*gall. oesophagus*).

| نَسْمَة | morbus in gutture.

| نَسْمَة | morbo gutturis affectus.

✓ | نَسْمَة | inus.; cfr. نَسْمَة ,

s. سَخْفٌ , et ar. تَحْفَفَ tenuis, levis
fuit.

Pa. نَسْمَة debilitavit, humiliavit.

Aph. آسْفَك discaleatus est ;
fatigavit, fessum reddidit.

| نَسْفَهَا | discaleatio.

| نَسْفَهَا | id.

✓ | نَسْمَة | , fut. نَسْنَة , ar. ئَخْرَى ,
stertuit.

| نَسْنَة | rhonus.

| نَسْنَة | nares.

| نَسْنَة | , pl. نَسْنَمَة et نَسْنَمَة , chald
نَاهِرَة , ar. مَنْخَرٌ , nares, nasus,
tabula lignea. نَسْنَمَة وَوَجْهًا aurea rostra candelabri.

✓ | نَسْمَة | , fut. نَسْمَة mussita-
vit; divinavit; cfr. heb. וְנַחַן ,
auguria cepit, et ar. ئَجِسْ si-
nistri ominis fuit. Part. act.
نَسْمَة ; subst. hariolus.

Pa. نَسْمَة id.

Ethpa. نَسْمَة incantatus est;
ominatus est.

| نَسْمَة | et نَسْمَة divinatio; incan-
tatio, omen, augurium.

| نَسْمَة | , ar. نَحَاسَ , heb. נַחַסּ , aes.
نَسْمَة | , f. سَعْمَة aereus; faber
ferrarius.

| نَسْمَة | hariolus; faber ferrarius.

| نَسْمَة | مَنْسُكَةً hariolus.

| نَسْمَة | مَنْسُكَةً augurium.

| نَسْمَة | , pers. تَخْصِيرٌ , venatio,
præda venatica; strages, cæ-
des; venator; strenuus.

| نَسْمَة | مَنْسُكَةً venatio; strenuitas.

| نَسْمَة | مَنْسُكَةً et نَسْمَةً bellator; fortis, strenuus.

| نَسْمَة | مَنْسُكَةً fortiter.

| نَسْمَة | مَنْسُكَةً venatio; strenuitas,
fortitudo.

↑ | نَسْمَة | , heb. וְנַחַן , fut. نَسْنَة ,
imper. نَسْمَة , descendit, de-
lapsus est; it. دَنْدَنَ دَنْدَنَ descendit;
profectus est, perrexit
ad aliquem, ad locum, c. دَلْلَى ,
لَهْمَى vel دَلْلَى ; incursionem
fecit, c. دَلْلَى vel دَلْلَى ; ortus est,
c. دَلْلَى . Part. præs. نَسْمَة , نَسْمَة ,
نَسْمَة descendantes in
pulverem: mortales. نَسْمَة
نَسْمَة مَهْمَى mortui. نَسْمَة مَهْمَى in
mare descendantes: navigan-
tes.

Ethpe. نَسْمَة se demisit.

Pa. نَسْمَة descendere fecit; de-

duxit ; *trop.* humiliavit ; demisit. *Part.* مُهْسِنٌ ; gramm. nomen puncti seu accentus tristitiae *infra litteras inscripti*, ex. : بُنْتَ.

Ethpa. مُهْسَلٌ demissus est ; *trop.* se demisit, se humiliavit.

Aph. مُهَبَّ descendere fecit, duxit ; depressit, depositus, dimovit ; *trop.* humiliavit, demisit. *Part.* مُهْسِنٌ , *nng.* مَهْسُدٌ , *f.* مَهْسُدٌ ; *subst. v.* *infra*. مُهْسَدٌ descensus.

مُهْسَدٌ *c., pl.* مُهْسَدٌ vestis talaris, pallium, vestimentum, tegumentum, stratum.

مُهْسَدٌ descendens.

مُهْسَدٌ , مُهْسَدٌ descendens ; *trop.* degener, vilis.

مُهْسَدٌ descensus ; *trop.* humilitas, vilitas.

مُهْسَدٌ descensus, defluxus; progenies, posteri ; mucus narium.

مُهْسَدٌ , *pl.* مُهْسَدٌ descensus, illapsus ; profectio, incursio ; depressio ; fundus, præcipitium.

مُهْسَدٌ descendere faciens, deprimens ; *subst.* descensus; ductus aquarum.

مُهْسَدٌ descensus.

مُهْسَنٌ humiliatio. مُهْسَدٌ descendens. مُهْسَدٌ humiliter. مُهْسَدٌ depressio, humiliatio ; submissio, obsequium (*gall.* condescendance).

مُهْسَدٌ , *pl.* مُهْسَدٌ , chald. مُهْسَدٌ , pistor, coquus.

Pa. مُهْسَدٌ *v. denom.*, panem coxit.

مُهْسَدٌ ars pistoris. مُهْسَدٌ malleus, pilum ; *cfr.* مُهْسَدٌ .

مُهْسَدٌ , fut. مُهْسَدٌ , humidus fuit ; *cfr. ar.* مُهْسَدٌ *id.*

مُهْسَدٌ humor, humiditas. مُهْسَدٌ et مُهْسَدٌ *id.* ; *cfr. etiam* مُهْسَدٌ *vocia*.

مُهْسَدٌ humidus. مُهْسَدٌ humiditas ; libido.

مُهْسَدٌ humiditas. مُهْسَدٌ lumbricus, vermis.

مُهْسَدٌ , fut. مُهْسَدٌ fulsit. *Part. præs.* مُهْسَدٌ , مُهْسَدٌ ; *subst.* fulgor.

Pa. مُهْسَدٌ *id.*

Ethpa. مُهْسَلٌ illuminatus est. مُهْسَدٌ , مُهْسَدٌ et مُهْسَدٌ fulgor, irradatio.

ወዕስ vel **ወዕስ** sordidus ; segnis.

ወዕቅዕ foeditas, sordes.

ወዕቅዕ pigritia, ignavia.

ወዕ, fut. **ወዕ** gravis, ponderosus fuit ; præpondereavit, se inclinavit ; it. hau sit aquam ; cfr. heb. **לִבְנָה**, sustulit, portavit, et **עַטֵּל** ex hausit.

Ethpe. **ወዕታት** gravis fuit.

Pa. **ወዕ** ingravavit.

Ethpa. **ወዕታት** dubius haesit ; it. humectatus est.

ወዕ vel አላዕ pondus ; cfr. ar. **عَلِل** mensura vinaria.

ወዕ effusio aquæ super totum corpus (gall. douche).

ወዕ hauriens ; it. vel **ወዕ** humidus.

ወዕለሁ graviter ; dubie.

ወዕ pondus ; dubium.

ወዕከሙ effusio ; humiditas.

ወዕ, **ወዕ** gravis ; dubius.

ወዕ et ውዕከሙ pondus, gravitas ; sedimen aquæ.

ወዕሳሁ calix, cyathus.

ወዕ et ውዕሳሁ pondus.

ወዕ, fut. **ወዕ et ውዕ** guttatum defluxit, stillavit

liquor ; cfr. heb. **נַתָּה** et ar. **نَطَفٌ** id.

Ethpe. **ወዕታት** pass.

Pa. **ወዕ** stillare sivit ; abundantius stillavit.

Ethpa. **ወዕታት ut Pe.**

Aph. **ወዕ** stillare fecit, instillavit.

ወዕ stillatio, gutta.

ወዕ, st. c. **ወዕ**, gutta, stillicidium ; sperma, ar. **نَطَفٌ** ; trop. parum quid ; adverb. paululum ; cfr. neo - ar. **شَتَّى**.

ወዕ gutta, pl. **ወዕ** ; gramm. duo puncta pluralis, id. q. hebraice ribbui.

ወዕ, id. q. **ወዕ**.

ወዕ humiditas.

ወዕ et ውዕ stacte ; althaea planta (gall. mauve, guimauve).

ወዕ stilla, gutta.

ወዕ stillatio, stillicidium ; gutta, unguentum.

ወዕ stillatio urinæ guttatum.

ወዕ, fut. **ወዕ et ውዕ**, nnq.

ወዕ, imper. **ወዕ et ውዕ**, nnq.

ወዕ, heb. **נְצָר** et ar. **نَطَافٌ**, custodivit, servavit, conservavit, mente retinuit ; distulit ; observavit, attendit, heb. **נְצָר** et

ar. ظَرَّ *observavit*. *Part. act.* ةَفْعُلُ, ةَفْعُلُ; *subst.* custos. ةَفْعُلُ ةَنْسَارِيُّ thesaurarius. ةَفْعُلُ ةَمَدْوَرُ tenens locum: vicarius. ةَفْعُلُ فَرْجَرْهُ personam gerens: *id.* ةَفْعُلُ ةَحْمَلُ custos ordinis: diaconus. ةَفْعُلُ ةَمَاتِيُّ custos vestitum; armiger. ةَفْعُلُ ةَمَدْهُمُّ qui stat juramento. ةَفْعُلُ ةَحْمَرُ observans calcem: insidiator. ةَفْعُلُ ةَقَنَّا custodes corporis: satellites. ةَفْعُلُ ةَوْكَارُ janitor. *Part. pass.* ةَفْعُلُ, ةَفْعُلُ servatus, etc.; *adj.* cautus; jejunus.

Ethpe. ةَفْعَلِي pass. et refl.; *it.* permansit.

Pa. ةَفْعُلُ custodivit, servavit.

Ethpa. ةَفْعَلِي pass.

Aph. ةَفْعُلِي conservavit. *Part. act.* et pass. ةَفْعَلُ, ةَفْعَلُ; ةَفْعُلُ ةَفْعُلُ quo dicitur sustentat vitam; *unde* *adv.* quantum sufficit ad conservationem vitae.

أَفْعُلُ ut seq.

أَفْعُلُ ةَفْعُلُ, emphat. ةَلِيَّةَ ةَفْعُلُ, pl.

أَفْعُلُ ةَفْعُلُ custodia; conservatio, observatio, observantia. ةَفْعُلُ

أَفْعُلُ ةَفْعُلُ custodia.

أَفْعُلُ ةَفْعُلُ ةَفْعُلُ custos; servator. observator; excubiæ, statio militum; palmes vitis; *cfr.* neo - ar. ظُورُ ةَفْعُلُ custos vineæ.

أَفْعُلُ ةَفْعُلُ caute.

أَفْعُلُ ةَفْعُلُ custodia; conservatio, salus; continentia; observatio.

أَفْعُلُ, ةَفْعُلُ ةَفْعُلُ custodia; conservatio; *it.* vox lat., notarius.

أَلِفْعُلُ ةَفْعُلُ, pl. ةَفْعَلُ, ةَلِفْعَلُ custodia, vigilia, excubiæ; specula, arx; ةَلِفْعُلُ ةَفْعُلُ ةَفْعُلُ excubias egit.

أَلِفْعُلُ ةَفْعُلُ thesaurizatio.

أَفْعُلُ ةَفْعُلُ custodiens, defendens; defensor tutelaris.

أَفْعُلُ ةَفْعُلُ ةَفْعُلُ custodia, vigilantia, providentia.

أَفْعُلُ, *id. q. سُ.*

أَفْعُلُ dens, dens molaris, *ar.* ئَابَنْ dens caninus.

أَفْعُلُ dentibus instructus.

أَفْعُلُ, pers. ئَيْدِي, vinculum femorale.

أَفْعُلُ, pers. نِيزَهُ et ar. شَبَرَى, hasta, lancea; jaculum; trop. meteorum (*gall.* étoile filante, bolide).

أَفْعُلُ ةَفْعُلُ dimin., hastula.

أَفْعُلُ ةَفْعُلُ ةَفْعُلُ nitrum.

أَفْعُلُ ةَفْعُلُ, pers. - ar. نِيلُ, indigofera tinctoria herba.

أَفْعُلُ ةَفْعُلُ, ar. نِيُّثُورُ et نِيُّثُورُ, nymphaea planta (*gall.* néufar).

أَفْعُلُ ةَفْعُلُ ةَفْعُلُ ةَفْعُلُ textura, flum.

נְסָמֵךְ σύμμαχος, sponsus.
נְסָנָה funis, funiculus, linea piscatoris.
נְסָמָעַ νεανίσκος, adolescentulus; *cfr.* מְסֻחָם .
נְסָנָה et נְסָנָה acinaces, gladius; *cfr.* نَمَارُوا .
נְסָמָעַ et נְסָמָעַ signum; *cfr.* heb. נְסָעַ id.
נְסָמָעַ νῆσσα, anas.
נְסָמָעַ νηστεία, jejunium.
נְסָמָעַ mensis Syrorum Aprilis
fere respondens, *heb.* נִירָן ,
ar. نِيَّان , *inde* tempus ver-
num.
נְסָמָעַ vernus.
נְסָמָעַ, pers. - *ar.* نِسْرِين , rosa
sylvestris (*gall.* églantine).
נְסָמָעַ נִיצָּחָה , victoria.

נְסָרָה , assyr. niru, *ar.* نَيْر ,
heb. נִנוֹר , jugum aratorium,
textorium; *trop.* subjectio.
נְסָרָה חֲנָה נְסָנָה socius; conjux.
נְסָרָה , v. s. מְסֻתָּה .
נְסָרָה , ut נְסָמָעַ vide supra.

נְסָמָעַ signum, vexillum;
scopus jaculorum, inde finis
consilium, mens; modus, re-
gula; exemplum, argumen-
tum; modus musicalis, me-

trum; *adverb.* حَتَّمٌ sub spe-
 cie, modo, instar. حَتَّمٌ هُوَ
 intendit, sibi proposuit; *cfr.*
 pers. *ar.* نِيشَانٌ, signum, sco-
 pus.
تَحْمِلُ signum; signifer, vexil-
 lum portans.

تَحْمِلُ, *heb.* תְּחַמֵּל et תְּחַמָּל, *ar.* تَحْمِلُ
 et تَحْمِلُ, fut. تَحْمِلُ, infin. مُتَحْمِلٌ,
 læsit, nocuit, *c.* تَحْمِلُ; trop.
 impugnavit, contrarius fuit.
 Part. act. تَحْمِلُ, تَحْمِلُ Part.
 pass. تَحْمِلُ, تَحْمِلُ.
Ethpe. تَحْمِلُ pass.
 Pa. تَحْمِلُ læsit.
Ethpa. تَحْمِلُ pass.
 Aph. أَتَفَعُلُ, fut. تَحْمِلُ et تَحْمِلُ, im-
 per. أَتَفَعُلُ, læsit, vulneravit,
 nocuit. Part. act. مُتَحْمِلٌ vel
 مُتَحْمِلٌ, f. مَحْمَلٌ; مَحْمَلٌ لَا مَحْمَلٌ
 lædit: nihil refert.
Ettaph. أَتَفَعُلُ pass.
تَحْمِلُ, تَحْمِلُ læsio, dolor; noxa,
 damnum, injuria, fraus.
تَحْمِلُ nocivus.
تَحْمِلُ et مَحْتَمِلٌ nocivus, contra-
 riis.
تَحْمِلُ مَحْتَمِلٌ injuria, fraus.
تَحْمِلُ مَدْحَمِلٌ qui lædi potest; læsus.
تَحْمِلُ مَدْحَمِلٌ ï illæsus.
تَحْمِلُ مَدْحَمِلٌ status molestus.
تَحْمِلُ مَدْحَمِلٌ nocive, moleste.

سَنْ stannum, *id. q.* أَنْدَارُ ; *cfr. heb.* אָנְדָר et *ar.* آنک.

سَنْدِيَّ *inus.* ; *cfr. ar.* نَكَّة spiritum immisit.

Pa. سَنْدِيَّ spiravit, flavit ; *cfr. سَنْدِيَّ* et *v. seq.*

سَنْدِيَّ flatus ; *cfr. ar.* نَفْخَة *id.*

سَنْدِيَّ, *fut.* سَنْدِيَّ spiravit, flavit, *cfr. præc.* *Part. pass.* سَنْدِيَّ, سَنْدِيَّ ; *adj.* usurp. suavis, lenis, mansuetus ; pudicus.

Aph. أَنْدَارُ *id.*

سَنْدِيَّ flatus, *ut* أَنْدَارُ.

سَنْدِيَّ سَنْدِيَّ suaviter, pacifice.

سَنْدِيَّ سَنْدِيَّ suavitas, lenitas ; pudor.

سَنْدِيَّ, سَنْدِيَّ suavis, lenis, mansuetus.

سَنْدِيَّ lenitas ; pudor.

سَنْدِيَّ et سَنْدِيَّ, *fut.* سَنْدِيَّ et سَنْدِيَّ defraudavit, decepit c. سَنْدِيَّ pers., adulteravit rem ; *cfr. heb.* סָנְדֵל corruptus fuit, vitiosus fuit, odio habuit. *Part. pass.* سَنْدِيَّ, سَنْدِيَّ ; *adject.* fraudulentus, dolosus, pravus.

Pa. سَنْدِيَّ fraudavit.

Ethpe. سَنْدِيَّ dolo usus est, c. سَنْدِيَّ ; deceptus est.

Aph. أَفْلَى machinatus est, insidias paravit ; falso opinatus est, sibi visum est ; *cfr. etiam* أَفْلَى, *s.* سَنْدِيَّ.

سَنْدِيَّ dolus, perfidia.

سَنْدِيَّ dolosus, perfidus.

سَنْدِيَّ dolose, perfide.

سَنْدِيَّ ut سَنْدِيَّ.

سَنْدِيَّ سَنْدِيَّ perfidus, deceptor.

سَنْدِيَّ سَنْدِيَّ perfidia.

سَنْدِيَّ سَنْدِيَّ scandalum.

سَنْدِيَّ سَنْدِيَّ vis imaginativa, excogitativa.

سَنْدِيَّ سَنْدِيَّ imaginatio, suspicio, opinio.

سَنْدِيَّ سَنْدِيَّ perfidia, proditio.

سَنْدِيَّ, *fut.* سَنْدِيَّ, *imp.* سَنْدِيَّ immolavit, jugulavit ; interfecit.

Ethpe. سَنْدِيَّ *pass.*

Pa. سَنْدِيَّ *ut Pe.*

Ethpa. سَنْدِيَّ *pass.*

سَنْدِيَّ, *pl.* سَنْدِيَّ victimā ; *in pl.* per extens. greges, armenta, inde possessiones, opes, *heb.* سَنْدِيَّ.

سَنْدِيَّ سَنْدِيَّ immolatio ; frustum carnis.

سَنْدِيَّ سَنْدِيَّ eunuchus, castratus ; *cfr. ar.* نَكَّس debilis.

سَنْدِيَّ, *pl.* سَنْدِيَّ victimā ; immolatio.

بَحْتَمْلَأ immolatio.

بَحْتَمْلَأ et بَحْتَمْلَأ mactator, jugulator.

بَحْتَمْلَأ qui immolari potest.

[↑] بَحْتَمْلَأ et بَحْتَمْلَأ, fut. بَحْتَمْلَأ et بَحْتَمْلَأ veritus est, erubuit; modeste se gessit, castus fuit; *impers.* بَحْتَمْلَأ كَ me puduit; *cfr. ar.* بَحْتَمْلَأ vitavit præ pudore. Part. act. بَحْتَمْلَأ; بَحْتَمْلَأ immodestus, impudicus.

Ethpe. بَحْتَمْلَأ erubuit.

Pa. بَحْتَمْلَأ erubescere fecit; purum reddidit, castum servavit. Part. act. بَحْتَمْلَأ. Part. pass. بَحْتَمْلَأ; modestus.

Ethpa. بَحْتَمْلَأ pudore affectus est; sobrius, castus factus est; modeste se gessit, se cohibuit, immunis fuit a malo.

بَحْتَمْلَأ pudor.

بَحْتَمْلَأ, بَحْتَمْلَأ, f. بَحْتَمْلَأ pudicus, castus; sobrius, modestus; monachus.

بَحْتَمْلَأ caste.

بَحْتَمْلَأ castitas, pudicitia, sobrietas, modestia.

بَحْتَمْلَأ pudicus, castus.

بَحْتَمْلَأ pudor.

بَحْتَمْلَأ pudicus.

بَحْتَمْلَأ castum, purum faciens.

بَحْتَمْلَأ inus.; cfr. ar. بَحْتَمْلَأ negavit.

Pa. بَحْتَمْلَأ repudiavit.

Pali بَحْتَمْلَأ extraneum fecit, alienavit; c. acc. vel بَحْتَمْلَأ pers. et بَحْتَمْلَأ rei, removit; adulteravit rem. Part. act. بَحْتَمْلَأ, بَحْتَمْلَأ negativus. Part. pass. بَحْتَمْلَأ بَحْتَمْلَأ, بَحْتَمْلَأ alienus, expers; c. بَحْتَمْلَأ diversus a.

Ethpali. بَحْتَمْلَأ pass. et refl.; repudiavit, negavit. بَحْتَمْلَأ كَحْتَمْلَأ مَحْمَدْمَه dissideat a vestra synodo.

بَحْتَمْلَأ, بَحْتَمْلَأ, f. emph. بَحْتَمْلَأ extraneus, alienus, peregrinus, *unde* excommunicatus; it. insolitus.

بَحْتَمْلَأ peregrine; apud gramm. irregulariter.

بَحْتَمْلَأ alienatio, separatio, defectio, ignorantia; novitas rei, doctrinæ.

بَحْتَمْلَأ alienans.

بَحْتَمْلَأ et بَحْتَمْلَأ بَحْتَمْلَأ alienatio, amotio.

بَحْتَمْلَأ anachoreta, v. s. بَحْتَمْلَأ. بَحْتَمْلَأ exstat in part. pass. بَحْتَمْلَأ fixus.

بَحْتَمْلَأ, fut. لَمْ, imper. لَمْ

- momordit ; *cfr. heb.* הַכָּה per-
cussit. *Part. pass.* חִמֵּדָה ,
f. *emph.* חִמְדָא .
- Ethpe.* חִמְדָא pass.
- Pa.* חִמֵּדָה graviter momordit ;
trop. חִמְדָה רַחֲתָה sibi digitos
præ dolore vel pœnitentia
momordit.
- Ethpa.* חִמְדָא pass.
- |mordax.
- |mordens.
- dolor.
- mordax.
- morsus.
- mordens ; sumens buc-
cellam.
- et mordax morsus.
- mordens, pungens.
- incubo, v. s. נֶבֶל .
- Lex , חִמְדָה , נְבוֹלָה , ar.
نَامُوس , lex, mos, regula ; it.
νομός , præfectura. חִמְדָה lex
mosaica. חִמְדָה וְסֹוֹתָה lex
libertatis seu lex evangelica ;
it. privilegium. חִמְדָה Deuteronomium.
secundum legem ; de mo-
re.
- Ethpalp.* חִמְדָה v. *denom.*,
promulgata est lex ; intra
leges sancita est.
- legaliter, jure.
- legalis, legitimus ; c. ۰ ,
illegalis, illegitimus.
- legalitas.
- legalitas, jus, rec-
tum, *pl.* חִמְדָה ; c. ۰ , injus-
titia, iniqutias.
- Pa. חִמֵּדָה movit, fræna-
vit ; *cfr. ar.* חִמְטָה direxit, os-
tendit, et חִמְטָה modus, regula.
- Ethpa.* חִמְדָא pervenit.
- Pau.* חִמְטָה id. q. *Pa.*
- stragulum, tapetum, ar.
تَمَطْ , pers. تَمَدْ id.
- ، id. q. تَمَدْ .
- f., *heb.* חִמְלָה et ar. قَنْقَلٌ ,
formica ; verrucæ species ;
id. q. seq.
- et חִמְלָה m., nidus formicarum.
- ، ar. قَنْقَلٌ , ichneumon
(gall. rat de Pharaon).
- ، نَهْرَةٌ , vindicta.
- ، f. חִמְרָה , ar. تَمَرْ , pardus,
tigris ; it. tiaræ species, ar.
تَمَرَةٌ .
- ، cavea ferarum.
- Pa.* חִמְרָה v. *denom.*, rugiit,
infremuit.
- Ethpa.* חִמְרָה , ar. تَمَرْ , infre-
muit, more pantheræ dilace-
ravit.

مَنْجُوَةٌ، pers. نَجْوَةٌ، mentha.
Pa. تَسْتَعِي infantem cantibus so-
pivit, lallavit.

مَنْجَوَةٌ، ar. نَجْوَةٌ، mentha.
أَصِنَّاصٌ تَسْتَعِي acinaces, gladius ; cfr.
نَسْوَةٌ، s. نَسْوَةٌ.

معن *inus.* ; cfr. heb. נַחַת tenta-
tavit.

Pa. تَسْتَعِي tentavit, expertus
est ; exploravit, scrutatus
est ; c. مَنْجَوَةٌ et inf. vel c. ، et
fut., conatus est ; cfr. heb. נַחַת tenta-
tavit. Part. act. تَسْتَعِي ;
تَسْتَعِي وَمَنْجَوَةٌ tentator. Part.
pass. تَسْتَعِي ، مَنْجَوَةٌ tentatus,
exercitatus ; expertus ; c. نَسْوَةٌ ،
inexpertus ; in pl. emph.
لَهْبَرٌ leprosi.

Ethpa. تَسْتَعِي pass.

أَنْجَاهَا fut. Pa. v. مَلَأَ .
أَنْجَاهَا et مَنْجَوَةٌ probatio, tenta-
tio; experientia, experimen-
tum ; calamitas ; c. نَسْوَةٌ , inexpe-
rientialia.

أَنْجَاهَا creditum seu mora in
solvendo ; cfr. ar. نَسْأَةٌ ، et
heb. نَسْأَةٌ mutuum dedit.

أَنْجَاهَا adj. a. præc., credito
traditum.

أَنْجَاهَا tentatio, exploratio.

أَنْجَاهَا probatio, experi-
mentum.

أَنْجَاهَا experimentalis, ex ex-
perientia notus.

أَنْجَاهَا tentator, f. emph.
أَنْجَاهَا more tentatoris, pro-
bationis ergo.

أَنْجَاهَا tentatio.

أَنْجَاهَا مَنْجَوَةٌ et لَهْبَرٌ ، pl.
أَنْجَاهَا libra, trutina, bilanx.

أَنْجَاهَا in libra ponderatus,
inde aequus, justus.

أَنْجَاهَا tentatio.

أَنْجَاهَا v. s. تَسْتَعِي .

معن, fut. تَسْتَعِي , imper.
أَنْجَاهَا , pl. مَنْجَاهَا vel مَنْجَاهَا , f.
أَنْجَاهَا ، c. suff. تَسْتَعِي ،
أَنْجَاهَا مَنْجَاهَا vel تَسْتَعِي
nnq. تَسْتَعِي , infin. مَنْجَاهَا ,
cepit, accepit ; assumpsit,
suscepit ; sustulit, abstulit ;
gramm. derivavit ; tali sensu
acepit vocem seu intellexit ;
أَنْجَاهَا et لَهْبَرٌ دَخَلَتْ
uxorem ; c. مَنْجَاهَا dativi, elegit
uxorem alicui. مَنْجَاهَا in captivitatem redegit.
أَنْجَاهَا vel حَفْرَهُ حَفَقَ قَاقِيلَ
faciem seu personam alicui-
jus : illi morem gessit, ac-
quievit ; respectum habuit
ad, curavit ; communius ini-
que favit alicui. حَفَقَ دَحْرَجَ

in mentem cepit : recordatus est. **بعض** *impetum cepit* : viriliter egit. **بعض** *cūram suscepit*. **بعض** *mentem abstulit*. **بعض** *ad se vocavit*. **بعض** *fidem alicujus de propria salute accepit*. **بعض** *conversationem ejus acceptam invenit*, ea fruitus est. **بعض** *belum suscepit*. **بعض** *sumpsit res, absoluta est*. **بعض** *suscepit in manibus suis seu rexit*. *Part. act.* **بعض** *hypocrita*; **بعض** *personarum acceptor*. **بعض** *ori suo indulgens*: inconsultus, protervus. **بعض** *Spiritus Sanctus qui a Filio accipit i. e. procedit*. *Part. pass.* **بعض**; **بعض** *mente captus*. *Ethpe.* **بعض** *pass.*; gramm. derivatus est, subauditus est. **بعض** acceptor, susceptor; *c.* **بعض vel absol.**, *sumentes mysteria*: communioni eucharisticæ participantes, *inde fideles*.

بعض acceptio; **بعض** *hypocrisis*.

بعض derivative. **بعض** acceptio, assumptio; communio eucharistica; gramm. derivatio; exceptio (*ar.* إِسْتَدْرَاكٌ). **بعض**, *nnq.* **بعض**, *c. suff.* 1st pers. **بعض**, *pl.* **بعض**, 2nd **بعض**, *pl.* **بعض**, 3rd **بعض**, *pl.* **بعض**, acceptio, receptio; ademptio; **بعض** acceptio personarum, hypocrisis. **بعض** *vel absol.* **بعض** conjugium. **بعض** **بعض** *acceptione et datione*: commercium (*ar.* الْأَخْذُ وَالْطَّهْرُ). **بعض** sumptus. **بعض** *translate, tropice*. **بعض** *acceptio, sumptio; translatio*.

بعض, *fut.* **بعض**, *imper.* **بعض**, *infin.* **بعض** *et* **بعض**, fudit, effudit, infudit; *nnq.* se effudit; conflavit metalла; *trop.* de novo formavit, *heb.* נָסַב; *it.* transcripsit librum, *ar.* نَسَبَ. **بعض** aquas effudit minister, *inde abs.* ministravit. *Part. act.* **بعض**, *subst.* effusio; fluctus; cataracta; medica-

mentum in nares infusum,
ar. نَشْرٌ ; it. exemplar *libri*,
ar. نُسْخَة . Part. pass. بَعْثَدْ ;
subst. conflatile, idolum.

Ethpe. بَعْثَدْ pass. et refl.
بَعْثَدْ fusio, effusio ; it. ut seq.
بَعْثَدْ fusio, conflatio ; conflatu-
tura.

بَعْثَدْ conflator ; infundibulum
(gall. entonnoir).

بَعْثَدْ conflatio.

بَعْثَدْ effusio, torrens ; canalis.
بَعْثَدْ , ar. نُسْخَة , exemplar, co-
dicis transcriptio.

بَعْثَدْ , بَعْثَدْ clyster.

بَعْثَدْ et بَعْثَدْ id. ; rutabulum.

بَعْثَدْ vel etiam بَعْثَدْ
voces copistio, nosocomium ;
hospitium.

بَعْثَدْ inus. ; cfr. بَعْثَدْ .

Ethpe. بَعْثَدْ et بَعْثَدْ
infirmatus est, aegrotavit ;
cfr. بَعْثَدْ .

Ethpa. بَعْثَدْ id.

بَعْثَدْ et بَعْثَدْ debilis, infir-
mus ; nondum clausum vul-
nus. بَعْثَدْ mens infir-
ma. فَتَ بَعْثَدْ oculus lan-
guidus, mollis.
بَعْثَدْ debiliter.

بَعْثَدْ et بَعْثَدْ infirmi-
tas.

بَعْثَدْ , fut. irreg. v. بَعْثَدْ .

بَعْثَدْ , fut. بَعْثَدْ serra secuit,
fudit, dissecuit ; expandit cri-
nes ; cfr. ar. نَشَرْ id. Part.
act. بَعْثَدْ , بَعْثَدْ ; subst. serra.
Part. pass. بَعْثَدْ , بَعْثَدْ ;
lapis sectilis.

Ethpe. بَعْثَدْ dissectus est,
diruptus est.

Ethpa. بَعْثَدْ dissectus est.
بَعْثَدْ sectio, dissectio ; asser,
tabula ; fissura ligni serra de-
secti.

بَعْثَدْ id quod expanditur, inde
velamen, velum.

بَعْثَدْ sectio ; particulæ quas
serra dispergit, scobs, ar.
نُشارَة .

بَعْثَدْ serra secans.

بَعْثَدْ dissectio.

بَعْثَدْ et بَعْثَدْ serra, ar.
منشار ; delphinus seu potius pis-
tris cetæ (gall. scie) ; it. ut
seq.

بَعْثَدْ paropsis magna.

بَعْثَدْ dissectio.

بَعْثَدْ pectus animalium, v. s. بَعْثَدْ .
بَعْثَدْ corvus, ar. تَاعَبْ ,
a تَاعَبْ crocitavit corvus ;
بَعْثَدْ pulli corvorum.

بَعْثَدْ , fut. نَهْ abripuit ;

discerpsit, dilaceravit; *cfr. ar.* تَأْشِيَّتْ *et تَهَشِّيَّتْ id.*

Ethpe. تَأْبِيلْ *pass.*

Pa. تَخْرُجْ traxit, abripuit.
Part. pass. تَخْرُجْ abreptus;
volutatus in pulvere, pollutus.

Ethpa. تَأْبِيلْ abreptus est.

ابْرَهْتْ abreptio; lapsus gravis.
تَهَوَّدْ *id.*

جَنْسْ genus quoddam semi-num.

جَنْسْ, *fut.* تَحْرِفْ experrectus est;
cfr. ar. تَأْثَرْ erexit, suscitat-
vit, *et تَهَزِّيْزْ movit, erexit.*

جَنْسْ experrectus, evigilans.

جَلْجَلْ, *fut.* تَحْمِلْ pulsavit;
cfr. ar. تَعْضَى et تَعْظِيْتْ mo-
vit, erexit.

جَهْلْهَلْ pigrities, foeditas.

جَهْلْهَلْ aroma, odoramentum.

جَهْلْهَلْ piger; foedus.

جَهْلْهَلْ aroma.

جَلْلَلْ, *heb.* גַלְלָל, *ar.* تَفْلِلْ, calceus,
solea; tugurium arundineum
sine fenestra.

Pa. تَخْرُجْ *v. denom.*, solea muni-
vit equum.

جَحْمَنْ ut usitatius *Pa.*; *cfr. heb.* גַהְמָן, *ar.* تَوْغِيْرْ gratus, sua-

vis fuit *et تَهَجِّيْرْ susurravit modu-
lationem.*

Pa. تَخْرُجْ suaviter, modulate
cecinit, *ar.* تَهَجِّيْرْ; *it.* asseruit,
ar. تَهَجِّيْرْ affirmavit.

Aph. تَحْكِمْ reprehendit.
تَحْمِلْ, *pl.* تَحْمِلْمُوا, تَحْتَمْ vox
lenis, vocis sonus; modulatio,
cantus, canticum, *ar.* تَهَجِّيْرْ .

تَهَجِّيْرْ, *ar.* تَعَامِة struthio, stru-
thiocamelus; تَهَجِّيْرْ *id.*

تَهَجِّيْرْ modulationem referens.
تَحْفَلْ juba equi, etc; *cfr.* تَحْفَلْ .

تَهَوْلْ, *fut.* تَهَوْلْ grunnivit sus;
cfr. ar. تَهَطْ hinnivit equus.
تَهَمْ, *q. n.* تَهَمْ corvus; *cfr.*
ar. تَقْ crocitavit.

جَلْدْ, *heb.* גַלְדָה, *ar.* تَهَدْ, *fut.*
تَهَدْ rudiit asinus; nnq. ru-
giit fera; trop. tuba clanxit.

Ethpe. تَأْبِيلْ rudiit.
جَهْلْهَلْ rudens, rugiens; *it.* mola
aquaria; *cfr. heb.* גַلְדָה, excus-
sit, rejectit, *inde ar.* تَاعِرَة
(gall. noria).

جَهْلْهَلْ, *pl.* تَهَوْلَاتْ mola aqua-
ria.

جَفْنَةْ, *pl.* تَفْلِلْ purgamentum,
quisquiliae, *ar.* تَفَلَّيْتْ *id.*, a تَفْيْ
rejectit.

نَفَّ, fut. نَفَّ erravit, defecit ;
cfr. ar. نَفَدَ id., v. نَفَ.

نَفَّ, fut. v. نَفَ.

نَفْسٌ, fut. نَفَّسُ, imp.
نَفَّسَ, flavit, inspiravit ; suf-
flavit, inde extinxit lumen,
ventilavit granum, etc.; trop.
inflavit, superbiā replevit ; it.
tumuit ; cfr. heb. נֶבֶל et ar.
نَفَّ flavit ventus, odor, et نَفَّ
suflavit, inflavit ; tumuit.
Part. act. نَفْسٌ مِنْ نَفْسٍ ; نَفْسٌ
vel نَفْسٌ مِنْ نَفْسٍ vas sponta-
neo aeris ductu munitum.
Part. pass. نَفْسٌ inflatus ;
superbus.

Ethpe. نَفْلَةً pass. intumuit ;
trop. superbus evasit.

Pa. نَفَّسَ sæpe aut vehemen-
ter flavit. Part. pass. نَفْسٌ .

Ethpa. نَافَّاً inflatus est,
insuflatus est ; intumuit ; su-
perbus evasit.

نَفْسٌ flatus ; inflatio, insufflatio.
نَفْسٌ flans, inspirator.

نَحْسٌ protuberantia iridis ocul-
lorum.

نَفْسٌ insufflatio.

نَفْسٌ more superborum,
insane.

نَفْسٌ tumor ; inflatio, super-
bia.

نَحْسٌ ut نَحْسٌ فَسْدٌ .

نَفْسٌ inflatio, flatus ; eructatio ;
vesica inflata, ar. نَفَاخَة .

نَفْسٌ flatum movens.

نَفْسٌ et نَفْسٌ follis, ar.
نَفَّاخَ .

نَفْسٌ spiratio ; flabellum.

نَفْسٌ , v. s. نَفَّ .

نَفْسٌ afflatus, inspiratio ;
spiraculum, ventilabrum, fla-
bellum ; pl. نَفَّاسٌ ; seq.
أَنْفُواً , eruptio ignea e monte.

نَفْتَهُ , pers. نَفَتْ , ar. نَفَطْ ,
naphta, species bituminis.

نَفْتَنَةً , ar. نَفَّاتَةً , pustula.
نَفْتَنَةً et نَفْتَنَةً λαμπτήρος , lu-
cerna, spec. laterna in qua
accenditur naphta.

نَفْتَنَةً scalpellum.

نَفْتَنَةً ignem emittens ; lucer-
nas accendens.

نَفْلٌ, heb. נְבָל, fut. نَفَلٌ ,
imper. نَفَلٌ , inf. نَفْلٌ , lapsus
est, cecidit, corruit, defecit ;
trop. incidit, accidit ; con-
gruit, c. نَفَلٌ vel حَذَّ ; c. motu
irruit, adortus est, insecurus
est, seq. حَذَّ , حَذَّ vel حَذَّ ; c.
نَفَلٌ , decidit de loco ; gramm.
præfixa est nomini una ex-
litteris حَذَّ ; excidit littera,

c. نَفَّلَ مَذَاهِبًا وَحَسْدًا ; مُسْنَمٌ jacta sunt fundamenta domus Domini. نَفَّهَ قَاتِلًا projecti sunt in vincula. نَفَّلَ in carcerem conjectus est. نَذَرَ حَكْمَةً concidit animus ejus præ timore illius hostis. نَفَّ حَكْمَةً وَسَلْدًا occupavit eum timor. وَنَفَّلَ حَكْمَةً وَأَوْجَمَا vel quod ipsi æquivalet. نَفَّلَ ceccidit super terram seu in acie succubuit ; se prostravit. نَفَّلَ حَمْرَأَةً mulierem novit. نَفَّلَ confugit, transfugit ad aliquem. نَذَرَ امْسِيَةً placuit ei oratio ejus. Part. præs. نَفَّلَ cadens; epilepticus; subst. desertor. Part. præt. نَفَّلَ , نَفَّلَ succumbens, vide infra usitatius نَفَّلَ .

Ethpe. نَفَّلَ defecit; irruit, c. نَفَّلَ .

Pa. نَفَّلَ cadere fecit. *Part. pass.* مَنْفَعَلًا decidens.

Ethpa. نَفَّلَ cessavit; remissus est.

Aph. نَفَّلَ cadere fecit, dejecit; trop. omisit. *Part. act.* نَفَّلَ , f. emph. مَنْفَعَلًا . *Part. pass.* نَفَّلَ , مَنْفَعَلًا , مَنْفَعَلًا ; subst.

vide *infra*; ap. gramm., *id.* q. مَنْفَعَلًا .

نَعْلًا deciduum; laurus, malobathrum; cfr. ar. نَعْلَا planta odorifera.

نَقْلًا jactus, prostratus, dejec-tus; gramm. excidens littera.

نَتْفَهَلًا ruina, strages.

نَادَلَهَلًا , pl. مَنْفَعَلَتَهَلًا et مَنْفَعَلَكَهَلًا casus, lapsus; trop. ruina; delictum; gramm. casus; præfixa una ex litteris نَادَمَا , مَنْفَعَلَهَلَا ; حَمْلًا epilepsia. نَادَلَهَلًا casus; abductio in carcerem; c. نَادَمَا invasio; مَنْفَعَلَهَلَا casus in lectum: morbus; ap. gramm. præfixio litterarum نَادَلَهَلًا .

نَادَلَهَلًا caducus.

نَادَلَهَلًا status ejus qui caderre potest.

نَفَعَهَلًا , fut. نَفَعَهَلًا vel sortitus est, sortem immisit; cfr. فَعَلَهَلًا ; it. expandit, extricavit *gossipium*; ar. نَفَعَهَلَهَلًا . *Part. pass.* نَفَعَهَلَهَلًا sorte concessus; extricatus, carminatus.

Pa. نَفَعَهَلَهَلًا explicavit, extricavit *gossipium*.

نَفَعَهَلَهَلًا carminatio lanæ vel gos-

نَفْعٌ *vel abs.* emancipatus est. **نَفْعٌ مُّهْبِأً** ejectus est a sinu Ecclesiæ. *it. abs., a fide defecit, apostatavit; cfr. ar. مُنَافِقٌ impius.* **نَفْعٌ وَهْمًا**, *vel rarius* **دَهْمًا** se, *vel alium excusavit, defendit.* **نَفْعٌ مُّخْسِنٌ** notuit, celebris evasit; *cfr. ar. ئَنْقَرَ, erupit et ئَنْقَرَ exiit e latebris mus; commodius veniit merx.* *Part. præs.* **نَفْعًا**; *subst. ut نَفْعًا.* *Part. præt.* **نَفْعًا** *pro quo usitatiūs نَفْعًا v. infra;* **مُنْدَهْمًا** *egressus et ingressus: libertas agendi; modus se gerendi.* **نَفْعٌ حَمْنَهْ وَمَخْنَهْ** *intrans et exiens in capite populi: populo præpositus.*

Pa. **نَفْعٌ** exire fecit, eduxit; expendit pecuniam, tempus; instituit, exercuit, educavit.

Part. pass. **مَنْفَعًا**; exercitatus, eruditus.

Ethpa. **نَافَقَهُ** eductus est, ejectus est; institutus est; exercitatus est, *c. د.*

Aph. **نَفَمَ** egredi fecit, ad exitum coegit; produxit; emisit; eduxit, procedere fecit, protulit, extulit; ejicit, expulit; erogavit pecuniam,

*cum لَحْ rei, ar. أَنْتَقَ rei, ar. edidit librum, transtulit; exclusit ova; transegit tempus; extraxit, subtraxit, *c. مَهْ*; آفَعُ وَهْمًا excusatione, defensione usus est. آفَعُ حَمْلَهْ مَهْ iniquitatem eorum in ipsorum caput retulit. آفَعُ حَنْهُ بَعْدَهْ prodec filium tuum ut moriatur. آفَعُ لَحْ مَهْ مَهْ præposuit eum rei agendæ. آفَعُ كَحْهَا ad eventum duxit. آفَعُ كَحْهَا rumorem vulgavit. آفَعُ حَنْهُ foras emisit: expulit aliquem; extulit; dedit filiam matrimonio. آفَعُ حَنْهُ secum abduxit. *Part. act.* **مَنْفَعًا**. *Part. pass.* **مَنْفَعًا**, **مَنْفَعًا**; *subst. usurp. v. infra.* *Ettaph.* **نَافَلَهُ** pass.; *it. producta est linea; gramm., prolata est littera.**

نَفْعًا et نَفْعًا canalis.

نَفْعًا cloaca.

نَفْعًا gossipium e semine purgatum.

نَفْعًا et نَفْعًا exitus, egressus, spec. locus unde eruitur metallum seu fodina; **نَفْعًا وَسَعْدًا** succus uvarum immaturarum.

نَفْعًا fodina; *it. ut نَفْعًا*, egrediens; *inde monachus, quippe*

qui e mundo exiverit; pus-tula, tumor, lues.

نَفْعٌ et نَفْعٌ, ar. نَفْعٌ, im-pensa; viaticum, pl. نَفْعٌ et نَفْعٌ.

نَفْعٌ exiens, egrediens; pro-cedens *Spiritus Sanctus a Patre et Filio*; gramm., pro-lata vox.

نَفْعٌ exitus; theologice processio *Spiritus Sancti*; ap. gramm. et rhetores, pro-latio; c. نَلْكَدٌ, elocutio, elo-quentia.

نَفْعٌ dioecesis.

نَفْعٌ exiens; qui egres-sus est; productus; divulgatus, decretus; editus, trans-latus liber. نَفْعٌ egressus est. نَفْعٌ مُّنْقَطَّةٌ excentrici circuli.

نَفْعٌ exitus; versio, trans-latio.

نَفْعٌ exercitatio; c. حَدٌ, locus exercitationis.

نَفْعٌ multum expendens, pro-digus.

نَفْعٌ, pl. نَفْعٌ, نَفْعٌ, pl. نَفْعٌ, نَفْعٌ, nnq. نَفْعٌ, st. c. نَفْعٌ, egressio, exitus; c. نَهْرٌ, scil. نَهْرٌ vel نَفْعٌ نَفْعٌ, it. نَهْرٌ نَفْعٌ excusatio, apo-logia. نَفْعٌ نَفْعٌ ortus solis.

نَفْعٌ exitus sabbati: exeunte sabbato. نَفْعٌ وَجِيلٌ anno exeunte.

نَفْعٌ egressus; exitus, profec-tio, inde Exodus, nomen libri secundi Pentateuchi; compita; trop. mors; exitus rei, eventus; proventus terrae, productio; it. podex; ap. gramm. prolatio litterae. نَفْعٌ سَكَنٌ editio codi-cis accurata.

نَفْعٌ ejectio; derivatio.

نَفْعٌ ad egressum pertinens; c. حَتَّلٌ verba commendationis animae in agonia; ultima morientis verba.

نَفْعٌ, pl. نَفْعٌ, نَفْعٌ egressus; discessus, ejectio, rejectio; processio, profectio, expeditio; eventus; editio; versio, libri translatio; trop. pustulæ; apud gramm., pro-latio vocis; apud mathem., deductio.

نَفْعٌ, fut. نَفْعٌ efferatus est equus; fugit; c. نَهْرٌ ab-horruit; fremuit; cfr. نَهْرٌ et ar. نَهْرٌ aufugit; it. ebullivit olla.

Pa. نَفْعٌ fremuit; abhorruit a re.

Aph. **فَلِ** fugere fecit ; horruit ;
riguit *crinis*. *Part.* **فَمَهْ** ; hor-
ridus.

فِرْمِيتُس fremitus, ebullitio; pera
veterinarii.

نَفْعٌ, fut. نَفَعَ animatus est, respiravit; trop. inhavit, appetiit. Part. pass. نَفَعًا animatus, respirans; sensualis; subst., v. infra.

Ethpe. ایغۇزى animatus est, respiravit: *trop.* recreatus est.

Pa نَفَّ animavit, respirare fecit ; *trop.* recreavit. *Part.* *pass.* مَنْفَعُهُ , منفعاً , f. emph. مَنْفَعَةً animatus ; rationalis ; مَنْفَعَةً حَرَقَهُ arca animata : B. V. Maria ; لَا مَنْفَعُهُ inanimatus ; minerale.

Ethpa. **أَنْهَى** animatus est;
recreatus est.

نَفْسٌ, *f.*, *pl.* **نُفُسٌ**, *heb.* **נֶשֶׁת** *et ar.* **نَفْسٌ**, *halitus, vita; anima, animus, per extens. homo, persona; c. suff. ipse, etc. ; trop. appetitus, cupido; it. monumentum se-pulchrale, mausoleum.* **نَفْسٌ** *et سَلْمًا* **نَفْسٌ** *anima vi-*

أَنْجَى et أَسْدَى anima vivens : animal. أَنْجَى وَمَدَى vel abs. أَنْجَى cadaver. أَنْجَى anima præditus. أَنْجَى egomet,

نَعْمَّا nosmetipsi, tumet-
ipse, ۵۰۶۵ نَعْمَّا vel ۵۰۷۵ نَعْمَّا
ipsimet, etc. ; cfr. ar. نَعْمَّا
vel يَنْتَهِي egomet, etc. ; أَعْنَمَهُمْ seipso morti
أَعْنَمَهُمْ حَدَّمَا tradiderunt. حَدَّمَتْ نَعْمَّا
meis propriis oculis. حَدَّمَا وَنَعْمَّا
sua propria domus. حَدَّمَةٌ ؛ حَدَّمَهُ in semetipso
gloriatus est. حَدَّمَ حَدَّمَ liber ad meum usum. حَدَّمَ لَهُ
mors sibi conscientia. حَدَّمَا لَهُ
نَعْمَّا ad se rediit : se collegit.
حَدَّمَهُ نَعْمَّا sibi statuit rem
agendam. سَبَّ نَعْمَّا se exhibi-
tuit. حَبَّ نَعْمَّا simulavit.
وَكَمَا وَنَعْمَّا oratio mentalis,
secreta. مَهْنَبْ نَعْمَّا metem-
psychosis ; adverb. حَنْجَمَهُ
soli, nudi. مَمْ نَعْمَّا ex semetipso,
sua sponte, suo arbitrio. حَنْجَمَهُ دَمَنْجَمَهُ apud
seipsum.

رُسْپَانٌ et **رُخَامٌ** respiratio.
رُخَامٌ et **رُخَامٌ** respiration; trop. allevatio, juvamen, quies, refection.

رَقَامِنْا recreativus.
نَفَامِنْا respiratio.
نَفَقِمَانْا respiratio ; appetitus,
cupiditas.

عَمَّا animatus; anima rationali praeditus.

بَعْنَانَةٌ	animaliter.	Ethpe. بَعْنَانَةٌ pass. ; trop. conditus est.
بَعْنَانَةٌ	animatio.	Pa. بَعْنَانَةٌ firme plantavit.
بَعْنَانَةٌ	anima præditus ; ad animam spectans, mentalis.	Aph. بَعْنَانَةٌ permutavit rem cum alia, c. ب.
بَعْنَانَةٌ	animalitas.	بَعْنَانَةٌ, st. c. بَعْنَانَةٌ, pl. بَعْنَانَاتٌ, planta, germen ; surculus ; plantatio ; depositio ovorum locustæ in terra ; سَمَّةٌ بَعْنَانَةٌ zoophyton.
بَعْنَانَةٌ	animatio ; regnum animalie.	بَعْنَانَةٌ plantatio.
بَعْنَانَةٌ	v. s. بَعْنَانَةٌ.	بَعْنَانَةٌ plantator ; fundator.
بَعْنَانَةٌ	fut. بَعْنَانَةٌ, 1 ^a pers. بَعْنَانَةٌ, imper. بَعْنَانَةٌ, inf. بَعْنَانَةٌ, rixatus est, certavit ; pugnavit persona, res, c. بَعْنَانَةٌ vel بَعْنَانَةٌ aut بَعْنَانَةٌ ; cfr. הַצָּה Hiph. v. בְּזָה, altercatus est.	بَعْنَانَةٌ ut بَعْنَانَةٌ insite.
بَعْنَانَةٌ	بَعْنَانَةٌ pugnant sibi verba.	بَعْنَانَةٌ vegetativus.
Part. act. بَعْنَانَةٌ	بَعْنَانَةٌ.	بَعْنَانَةٌ aptus plantationi.
بَعْنَانَةٌ	et بَعْنَانَةٌ rixa, lis.	بَعْنَانَةٌ, fut. بَعْنَانَةٌ fulsit, cfr. ar. بَعْنَانَةٌ purus fuit ; trop. claruit, floruit, inde triumphavit ; nnq. exstitit ; it. transcripsit librum ; cfr. heb. בְּזָה et بְּזָה Aph. v. بَعْنَانَةٌ claruit.
بَعْنَانَةٌ	v. s. بَعْنَانَةٌ.	Pa. بَعْنَانَةٌ splendere fecit, triumphare fecit ; celebravit, celebrem, insignem reddidit ; palam protulit, ornavit.
بَعْنَانَةٌ	بَعْنَانَةٌ pugnax, contentiosus.	Ethpa. بَعْنَانَةٌ celebris factus est ; se insignivit, triumphavit, gloriam consecutus est ; præstítit ; prospere se habuit res ; c. بَعْنَانَةٌ, præclarior fuit, excelluit ; trop. in bello vicit.
بَعْنَانَةٌ	بَعْنَانَةٌ ut بَعْنَانَةٌ.	
بَعْنَانَةٌ	بَعْنَانَةٌ contentio, litigium.	
بَعْنَانَةٌ	بَعْنَانَةٌ, pl. بَعْنَانَاتٌ rixa, contentio.	
بَعْنَانَةٌ	بَعْنَانَةٌ contradictorie.	
بَعْنَانَةٌ	بَعْنَانَةٌ contradictorius.	
بَعْنَانَةٌ	fut. بَعْنَانَةٌ et بَعْنَانَةٌ, imper. بَعْنَانَةٌ, infin. بَعْنَانَةٌ et بَعْنَانَةٌ, heb. بَعْنَانَةٌ, ar. بَعْنَانَةٌ, plantavit ; fixit, stabilivit ; depositus ova locusta ; ædificavit, fundavit.	

Aph. اَنْجَلٌ splendidum fecit,
victorem reddidit; splenduit.
مُكْرِمٌ، مُكْرِمَةٌ, pl. مُكْرِمَاتٌ victoria,
triumphus; gloria, laus, en-
comium; res præclare gesta,
facinus; fastus.

clarus, purus de voce.
 triumphator; it. ut præc.
 , f. emph.
 splendens, clarus,
 victoriâ celebris, illustris,
 inde titulus dignitatis Marty-
 rum, Imperatorum; هُنَّا
 clarus sono vocis. هُنَّا
 pl. هُنَّا
 nomine clarus: celebris

نُورٌ مُسَمِّدٌ clare, gloriose.
نُورٌ مُسَمِّدٌ splendor, præstantia,
 excellenta; res prosperæ; it.
تِلْكُلُوسْ هُونُورِيُسْ titulus honoris.

مُهْلِكٌ triumphare faciens.

--- , fut. --- imper.
 --- , infudit; stillavit; cfr.
 --- ; et ar. --- id.

Ethpe. $\aleph\beta\lambda$ perfusus est.

Pa. effudit; custodivit.

Ethpa. $\text{v}_1 \text{L}_1$ pass.

سُوَّل effusio, stillatio; balneum aromaticum, ar. **نَطْرُول**.

cyathus, species *calicis*.

Nigai perfusio; stillicidium.

الْمَوْجُ destillatus.

دِسْتِيلَاتِيُونٌ destillatio.

سِبْلَاتٍ, fut. سِبْلَةٌ sibilavit
serpens; it. intumuit, increvit; trop. increpavit.

Ethpe. اپوں emissus est ; it. invaluit; *cfr.* اپنے.

Pa. تُوْف ejicere fecit; *cfr.* تُوف.

فُوقَالْهُمْ palmes vitis; capparis
herba.

ſ sibilus; it. *ut præc.*

لَوْقَنْ et **لَوْقَنْ** clarus, purru;
fortis.

լազո՞ւ claritas.

بِمُقَاعِدِ tegumentum capitis mulierum Romanarum, ar. **تَحْسِيفُ** capitis velamen.

رُبَدَةٌ rubedo crepusculi.

نُسُعَ - نُسُعٌ, heb. נָסַע, nisuś,
accipiter, avis prædatrix.

جَرَّعْ, fut. جَرَّعْ striduit, sonum edidit; grunnivit *sus*, pipivit *avis*; trop. lallavit *mater*, nutrix; laudavit; cfr. جَرَّعْ.

Pa. ; *mussitavit*, pipivit,
fritinnivit; *trop.* demulsit
lallando *mater infantes*; lau-
davit.

Ethpa. ئەڭلەن demulsus est;
laudatus est; vaticiniis cele-

bratus est ; allegorico sensu sumptus est sermo.

مُسْتَوْدَأْ et مُسْتَوْدَأْ mussitatio ; grun- nitus, pipitus.

مُسْتَوْدَأْ id.

مُسْتَوْدَأْ et usitatus مُسْتَوْدَأْ , pl. مُسْتَوْدَأْ susurrus ; blanda vox lallantis ; hymni.

مُسْتَوْدَأْ hæmorrhoides ; cfr. ar. مُصْرُورَهُ et مُصْرُورَهُ id. ; it. surculus, cfr. heb. נַצֵּר et ar. نَصَر viruit ramus.

مُسْتَوْدَأْ lallatio ; blandimentum ; pueri clamor.

مُسْتَوْدَأْ gemebunde.

مُسْتَوْدَأْ blandiens ; blandus.

مُسْتَوْدَأْ blande.

مُسْتَوْدَأْ blanditiae.

مُسْتَوْدَأْ gemebundus.

مُسْتَوْدَأْ , fut. Pe., v. زَوْ .

مُسْتَوْدَأْ , ar. نَصَارَائِيْ , Nazaræus ; Christianus.

مُسْتَوْدَأْ Christianismus ; it. innovatio.

لَجْلَجْ inus. ; cfr. ar. نَصَتْ auscul- tavit.

Aph. لَجْلَجْ auscultavit, intendit.

لَجْلَجْ , fut. لَجْلَجْ et لَجْلَجْ angus- tiatus est, cfr. لَجْلَجْ ; it. inclinatus est, dispositus est, aptus fuit. Part. præt. لَجْلَجْ ,

لَجْلَجْ inclinatus, paratus intentus ; propensus, promptus ; it. libamine conspersa victima ; purus, ar. نَقِيْ .

Ethpe. لَجْلَجْ inclinatus est.

Pa. لَجْلَجْ libavit, effudit ; immo- lavit ; trop. obtulit in sacris, vovit, e. ﴿ pers.

Ethpa. لَجْلَجْ pass. et refl.

لَجْلَجْ inclinatio, paratio, disposi- tio ; desiderium.

لَجْلَجْ , pl. نَعْدَةً , نَعْدَةً , ovis ; lignum molæ quod vertit ju- mentum.

لَجْلَجْ libatio; vas libatorium; ob- latio, libamen Eucharisticum.

لَجْلَجْ et لَجْلَجْ , pl. نَعْدَةً , heb. נְקִירָה , נְקִירָה , vas libatorium, patera.

لَجْلَجْ immolatus.

لَجْلَجْ immolatio.

لَحْفَ , heb. لَحْفَ , ar. لَحْفَ , fut.

لَحْفَ , imper. لَحْفَ , perfor- vit, perfodit ; infixit. Part.

pass. لَحْفَ , f. emph. لَحْفَ ; in f. emph. subst., collare li- gneum reorum (gall. cangue) ; per extens. compes ; trop onus ; it. ar. نَقِيب , princeps.

Ethpe. لَحْفَ pass.

Pa. لَحْفَ perforavit ; in femi- nino genere posuit nomen.

نَعْدُ, ar. نَعْدٌ, foramen; cuniculus.

نَعْدًا perforatio.

نَعْدًا, emph. نَعْدًا, st. c.

نَعْدًا, pl. نَعْدًا, femina, femineus sexus; بِنْدًا

mas et femina.

نَعْدَانَة fissuræ modo; ex feminino genere.

نَعْدَاءُ sexus femininus; gramm. genus femininum.

نَعْدَاءُ, it. نَعْدَاءُ et نَعْدَاءُ femininus.

نَعْدَاءُ genus femininum.

نَعْدَاءَةُ feminine, genere feminino.

نَعْدَاءُ et نَعْدَاءُ genus femininum; sexus muliebris.

نَعْدَاءُ gryllus.

نَعْدَاءُ genus femininum.

نَعْدًا, emph. نَعْدًا terebra, subula; foramen; it. in emph., machina bellica obsidionis.

نَعْدٌ, inus.; cfr. ar. نَعْدٌ punctis notavit, heb. נָעֵד punctis distinctus, et نَعْدٌ.

Ethpe. نَعْدٌ tenuis fuit.

Pa. نَعْدٌ purificavit, mundavit; cfr. ar. شَدَّ discrevit, separavit veros nummos ab adulteris.

Ethpa. نَعْدٌ pass.

نَعْدَةُ, emph. نَعْدَةُ, pl. نَعْدَاتٍ, punctorum notatio; punctum; gutta, ar. نَقْطَةٌ; pl. نَعْدَاتٍ depictio in carne (gall. tatouage).

نَعْدَاءُ, f. emph. نَعْدَاءُ, mundus, insons; tenuis, acuta littera; purus, nitidus, delicatus; suavis, palato gratus; subst. interula acu picta;

نَعْدَاءُ panis delicatus.

نَعْدَاءُ vestimenta sumptuosa. مَوَالَاتٌ نَعْدَاءُ vasa pretiosa. حَمَدَهٌ نَعْدَاءُ vita integra.

نَعْدَاءُ et نَعْدَاءُ, heb. נָעֵד, ar. شَدَّ, pastor; caprarius; trop. principes, magnates.

نَعْدَاءُ et نَعْدَاءُ pastoris munus.

نَعْدَاءُ pure, eleganter.

نَعْدَاءُ delicate, urbanus.

نَعْدَاءُ mundities.

نَعْدَاءُ mundatio.

نَعْدَاءُ id.

نَعْدَاءُ mundatus.

نَعْدَاءُ, fut. نَعْدَاءُ, imper. نَعْدَاءُ, pupugit; vulneravit; gramm., punctis seu vocalibus instruxit voces; cfr. ar. نَقْزَ pupugit serpens, cfr. et نَقْزَ punctis distinxit.

- Pa.* نَمْدَأْ graviter pupugit.
نَمْدَأْ punctio.
نَمْدَأْ, emph. اِلْتَهَمْدَأْ, pl. اِلْتَهَمْدَأْ et
نَمْدَأْ punctum, punctum
vocale; اِلْتَهَمْدَأْ مَنْمَنْ, اِلْتَهَمْدَأْ مَنْمَنْ puncta pluralis *seu* ribbui.
نَمْدَأْ punctis notata vocalis.
نَمْدَأْ, al. اِلْتَهَمْدَأْ rostrum avium.
نَمْدَأْ, fut. نَمْدَأْ confregit,
confodit, ar. نَمْدَأْ; it. crocita-
vit *corvus*.
Aph. نَمْسَأْ, ar. نَمْسَأْ contendit,
pertinax fuit.
نَمْسَأْ conftractio; crocitatio.
نَمْسَأْ مَنْمَنْ rixa, lis.
نَمْدَأْ, fut. نَمْدَأْ, imp. نَمْدَأْ
transportavit, ar. نَمْلَ; amo-
vit; purgavit, complanavit
viam. Part. act. نَمْكَأْ; نَمْكَأْ
complanantes viam.
Part. pass. نَمْلَ; subst. نَمْلَ
et نَمْكَأْ, ar. قَيْلَةً, assumen-
tum quo reparatur calceus.
Ethpe. نَمْفَلَأْ amotus est,
purgatus est.
نَمْكَأْ et نَمْكَأْ complanatio
vie.
نَمْدَأْ complanatus.
نَمْدَأْ, inus.; cfr. heb. נַפְנָא et
ar. نَمْدَأْ ultus est.

- Ethpe.* نَمْفَلَأْ ultus est, ultio-
nem exegit; c. نَمْدَأْ; castigavit.
Ethpa. نَمْكَأْ vindictam
sumpsit, c. حَلْ vel نَمْدَأْ; ultus
est, vindicavit; punitus est,
aflictus est, c. حَلْ.
نَمْدَأْ, emph. اِلْتَهَمْدَأْ, st. c. نَمْدَأْ,
pl. اِلْتَهَمْدَأْ ultio; retributio,
poena. مَنْمَنْ مَنْمَنْ poenas de-
dit.
نَمْدَأْ frustum carnis.
نَمْدَأْ fovea, caverna; cfr. ar.
نَمْدَأْ et قَاءَ locus depresso.
نَمْدَأْ species gemmæ, callais
(ar. فَيْرُوزَجَّ, gall. turquoise).
نَمْدَأْ, fut. نَمْدَأْ, imper. نَمْدَأْ,
inf. نَمْدَأْ, adhæsit, secutus
est, sectatus est, comitatus
est seq. acc. vel نَمْدَأْ; se adjun-
xit, spec. matrimonio; coivit;
se subdidit, consensit; trop.
convenit, congruit. Part. act.
نَمْدَأْ نَمْدَأْ; adj. æquus,
conveniens. Part. pass. نَمْدَأْ
id. q. usitatus نَمْدَأْ q. v.
infra; cfr. ar. قَيْلَةً secutus
est.
Ethpa. نَمْكَأْ adjunctus est;
se adjunxit; adhæsit, amore
prosecutus est; matrimo-
nio se conjunxit, coivit;

ap. gramm. affixum est *pronomen*; affixa accepit *nomen*.
Aph. مَفَّا adjunxit, adhærere fecit, applicuit; ad coitum induxit *mulierem*; sibi vindicavit, sumpsit, sibi devinxit *aliquem uti familiarem*, c. ﴿ agentis; addidit, subjunxit, perrexit; exorsus est, cœpit: se fixit in *loco*; مَفَّا حَّلَ vel بِنْجِيْفَهُ وَبِنْجِيْفَهُ اِنْجِيْفَهُ incepit facere. اِمْفَهُ لَعْنَهُ id. اِمْفَهُ حَدَّامَهُ incepit dicere. اِمْفَهُ اِنْجِيْفَهُ incepit vel perrexit dicere. مَفَّهُ كَمَّهُهُ instat consummatio nostra. بِنْجِيْفَهُ لَاؤْكَهَا humi oculos defixit; *imper.* اِمْفَهُ adde, perge, et *adverb.* porro, deinde. *Part. act.* مَفَّهُ vel مَامَفَهُ, f. مَمْفَهُ. *Part.pass.* مَهْفَهُ, مَهْفَهُ; adhærens.

Ethaph. مَامَلَ conjunctus est; *cfr. etiam* مَفَّا.
 مَهْدَهَا, pl. مَهْتَهَا conjunctio, successio modorum musicorum.
 مَهْفَهَا, pl. مَهْفَهَا adhæsio, conjunctio, consortium, comitatus, societas, congressus; coitus; cohaesio, consequentia. حَنْهُهُ مَهْفَهُ maritus tuus. حَنْهُهُ مَهْفَهُ لَهُهُ uxor tua. حَنْهُهُ مَهْفَهُ familiares.

نَهْدَهَا id.

نَهْفَهَ convenienter, consequenter; continuo; recte.

نَهْفَهَا adhærens; gramm. affixus, adverbium; سَكْهَ pronomen affixum. مَهْدَهَا مَهْتَهَا motus regularis; pl. f. نَهْتَهَا loca adjacentia regioni, urbi.

نَهْفَهَهَا conjunctio.

نَهْهَهَا adhærens, consequens; gramm. affixus (ar. المُضَاف: subst. sectator).

نَهْفَهَا، نَهْفَهَهَا adhærens, concomitans; comes, contiguus, vicinus; continuus; sequens, aptus, c. ﴿ congruens; nnq. *impers.* c. ﴿ agentis, copulam habuit; c. ﴿ rei, occupatus, cura prosequens; apud gramm. affixus; in pl. f. نَهْفَهَهَا confinia, vicina loca.

نَهْمَهْلَهَهَا consequenter.

نَهْنَهْفَهَهَا ad affixum pertinens.

نَهْفَهَهَا adhæsio, conjunctio; convenientia, consequentia; series, ordo continuus: coitus; *ap. gramm.* annexio, (*id. q. ar.* اِضَافَة); status constructus, pl. لَهَهَهَا affixa, scil. desinentiae nominum, præfixæ vel suffixæ litteræ in verborum flexione.

نَعْمَةً copula carnalis; percus-
sio; gramm. id. q. نَعْمَةً.

نَعْمَةً adjudicans.

نَعْمَةً et نَعْمَةً annexio
nominis; status constructus.

نَعْمَةً adhaesivus, socius;
gramm. ad alterum annexum
nomen (ar. الْجُصَافِ إِلَيْهِ). نَعْمَةً

consortium.

نَعْمَةً , heb. נִקְרָא , ar. نَقَرَ , fut.

نَفَّ excavavit; perfodit.

Part. act. نَفَّا ; subst. نَفَّا ; subst.

أَنْكَتَا نَفَّا ; أَنْكَتَا picus avis. Part.

pass. نَفَّا ; subst. cisterna.

Ethpe. نَفَّا لَبَقَ excavatus est.

Pa. نَفَّا ut Pe.

Ethpa. نَافَّا لَبَقَ ut Ethpe.

نَفَّا , al. نَفَّا , cavitas; massa
argenti vel auri.

نَفَّا excavatio; insitio germinis.

نَفَّا et نَفَّا rostrum avis,
ar. مِنْقَارٌ ; canalis.

نَفَّا cisterna, canalis.

نَفَّا terebra ; rostrum.

نَفَّا vas aquarium, amphora.

نَفَّا rostrum.

نَفَّا , fut. نَفَّا , imper.

نَفَّا , infixit clavum, fixit
tentorium, inde absol. castra
posuit prope, c. حَسَنَ , et per
extens. obsedit urbem; se

collisit, persona, res; allisit,
percussit; pulsavit instrumenta musica, januam c. حَسَنَ ,
campanam c. vel s. حَسَنَ , ar.

نَقَسَ , inde convocavit; seq.
نَفَّا , s. حَسَنَ , vel أَنْبَاتَا , c.

حَسَنَ , pl. plausat manibus; it. ceci-
nit avis. نَفَّا نَفَّا castra-
metatus est. مَنْفَعَهُ مَنْفَعَهُ اِنْ

pulsate et aperiam. Part. act.
نَفَّا ; f. emph. et subst. نَفَّا

نَفَّا pulsatrix, pl. نَفَّا .
Ethpe. حَمْخَأْنَفَّا pass.; cominus pugnatum est.

Pa. حَمْخَأْنَفَّا vehementer infixit;
pulsavit.

Ethpa. حَمْخَأْنَفَّا pass.

نَفَّا impactio, infixio.

نَفَّا collisio, pulsatio, tremor;
pulsus, ictus; حَفَّا complosio manuum. حَمْخَأْنَفَّا
conflictio, rixa; dolor capitidis;
apud gramm. vocalis.

نَفَّا ap. gramm., ex vocali
producta motio.

نَفَّا pulsans; pulsator, inde
psaltes; tintinnabulum, inde
ar. تَأْفِيسٌ id.; it. tintinnabuli
pulsator.

نَفَّا , pl. نَفَّا vocalis,
quippe quæ moveat consonantem; sonus; syllaba. حَمْخَأْنَفَّا
وَنَفَّا vocales.

بَهْمَمْ pulsatio, allisio; investigatione.

بَهْمَمْ pulsatus.

بَهْمَمْ pulsatio.

بَهْمَمْ palmes, v. بَهْمَمْ.

بَهْمَمْ securis; بَهْمَمْ وَنْبَهْمَمْ saccharum album (*gall.* sucre candi).

بَهْمَمْ dimin., parva securis, sareculum.

بَهْمَمْ nux indica, cfr. pers.-ar. نَارِجِيل (gall. cocotier).

بَهْمَمْ et, it. بَهْمَمْ وَبَهْمَمْ et بَهْمَمْ وَبَهْمَمْ vel بَهْمَمْ وَبَهْمَمْ pl. بَهْمَمْ وَبَهْمَمْ pers.-ar. تَرْدَنْ, تَرْدَنْ, grecce νάρδος, nardus.

بَهْمَمْ et بَهْمَمْ νάρκη, torpedo piscis (*gall.* torpille).

بَهْمَمْ et بَهْمَمْ νάρκη, pers. تَرْكِس, ar. تَرْجِس narcissus flos.

بَهْمَمْ νάرْثَيَه, pars ecclesiae in qua stabant catechumeni. بَهْمَمْ νάرْثَيَه, manubrium; cista pretiosior.

بَهْمَمْ homo, id. q. بَهْمَمْ.

بَهْمَمْ mulieres, pl. v. بَهْمَمْ.

بَهْمَمْ muliebris, effeminatus.

بَهْمَمْ heb. دَنْشَة, ar. تَيِّي, fut. بَهْمَمْ, imper. بَهْمَمْ, oblitus est.

Part. act. بَهْمَمْ. Part.

بَهْمَمْ pass. بَهْمَمْ oblivioni datus.

Ethpe. بَهْمَمْ oblitus est; pass. oblivioni datus est.

Pa. بَهْمَمْ in oblivionem duxit.

Ethpa. بَهْمَمْ id. q. Ethpe.

Aph. بَهْمَمْ, imper. بَهْمَمْ, ut Pa.

بَهْمَمْ oblivious, negligentia. بَهْمَمْ ex obligeone vel negligentia effectus.

بَهْمَمْ oblivious, mendum.

بَهْمَمْ oblivious dans.

بَهْمَمْ oblivious.

بَهْمَمْ oblivious datus; obliviouscens.

بَهْمَمْ oblivious.

بَهْمَمْ , fut. بَهْمَمْ et, imper. بَهْمَمْ , flavit ventus; trop. excitata est persecutio; intumuit.

Ethpe. بَهْمَمْ agitatus est; it. illaqueatus est; cfr. ar. تَشَبَّه, Pa. بَهْمَمْ ut Pe.

Aph. بَهْمَمْ flare fecit, ventilavit.

بَهْمَمْ , pl. بَهْمَمْ laqueus, rete.

بَهْمَمْ flatus.

بَهْمَمْ flans; proboscis animallum, id. q. بَهْمَمْ.

بَهْمَمْ flatus, aura.

بَهْمَمْ nebulositas, obscuritas.

بَهْمَمْ debilis, infirmus.

مَعْلُومٌ, fut. مَعْلُومٌ, pellem de-traxit, excoriavit; cfr. مَعْلُومٌ.

Ethpe. مَعْلُومٌ passiv.

Pa. مَعْلُومٌ excoriavit.

أَعْلَمْ et أَعْلَمْ exoriatio.

أَعْلَمْ id.

أَعْلَمْ decorticatus.

مَعْلُونٌ, heb. مَعْلُونٌ, ar. مَعْلُونٌ, fut. مَعْلُونٌ et مَعْلُونٌ flavit, spiravit; nasum emunxit; trop. venenum, iram spiravit, discordiam movit.

Ethpe. مَعْلُونٌ pass.

أَعْلَمْ , emph. أَعْلَمْ , st. c. مَعْلُونٌ , pl. أَعْلَمْ , c. aff. 1st pers. s. et pl. مَعْلُونٌ , مَعْلُونٌ , 3rd pers. pl. مَعْلُونٌ halitus, spiritus; res animata, anima; cfr. ar. مَعْلُونٌ id. مَعْلُونٌ extre-mus spiritus.

أَعْلَمْ rostrum avium; proboscis animalium.

أَنْفُسْ مَدْمُودٌ , ar. مَنْفِيَةً , nares.

مَعْلُوكٌ, usitat. in part. pass. مَعْلُوكٌ pistillo contusus; detersus; subst. simila; cfr. مَعْلُوكٌ purificavit.

Pa. مَعْلُوكٌ purgavit; detersit, cfr. ar. مَعْلُوكٌ id.

Ethpa. مَعْلُوكٌ pass.

مَعْلُوقٌ purgatio, abstersio.

مَعْلُوقٌ purgatio; detersio, claritas; magnus serpens.

أَعْلَقْ et مَعْلُوقٌ ut مَعْلُوقٌ .

مَعْلُوكٌ, heb. مَعْلُوكٌ , fut. مَعْلُوكٌ et مَعْلُوكٌ , imper. مَعْلُوكٌ , osculatus est; lambit.

Ethpe. مَعْلُوكٌ osculum accepit.

Pa. مَعْلُوكٌ pluries osculatus est; مَعْلُوكٌ se invicem amplexati sunt.

أَعْلَقْ ut seq.

أَعْلَقْ et مَعْلُوكٌ , pl. مَعْلُوكٌ osculum.

أَعْلَقْ osculator.

أَعْلَقْ oscula accipiens.

مَعْلُوكٌ, ar. مَنْفِيَةً , aquila; trop. aquila seu vexillum; constellatio aquilæ; it. fastigium tecti; it. filix planta (gall. fougère).

أَعْلَقْ , f. aquilinus , in f. actites lapis.

أَعْلَقْ aquilinus.

أَعْلَقْ , vox ar. مَنْشُور a rad. لَثَرَ , diploma.

مَعْلُوكٌ, fut. مَعْلُوكٌ et مَعْلُوكٌ infirmus fuit, languit, torpuit, remisit; defecit, cessavit; cfr. hec. مَعْلُوكٌ contabuit, ægrotata-

vit; trop. نَمْتَ أَمْبَتَةً des-
ponderunt animo. Part. præs.
نَمْأَ . Part. pass. نَمْسَهِ
id. q. v.

Ethpa. نَمْفَ لِ debilitatus est;
cfr. neo- ar. تَنْشَشْ ex mor-
bo convaluit ægrotus.

Aph. نَمْ torpere fecit.
نَمْمَهِ debilis, ignavus.
نَمْمَهِ ignave, languide.
نَمْمَهِ debilitas, ignavia.

لَمْ , fut. نَمْ effusus est,
heb. نَمْ ; it. jacturam subiit
cfr. نَمْ .

Pa. نَمْ læsit, damno afficit.
نَمْ et نَمْ detrimentum,
damnum.

نَمْ læsus.
نَمْ damnum.

لَمْ , heb. نَمْ , chald.
نَمْ , verbum defect. usurp.
tantum ut futurum verbi
نَمْ q. v. ; sic flectitur لَمْ ,
1^a p. لَمْ , 2^a p. لَمْ etc.,
infn. لَمْ vel لَمْ , c. suff.
نَمْ , etc. dabit; ponet, sol-
vet; لَمْ quis dabit?
quis efficere potest? لَمْ لَمْ
dabis judicium: judicaberis.
لَمْ adjuvit, c. لَمْ pers.,
لَمْ لَمْ لَمْ responsum dedit,

dixit (omnia scil. in sensu
perfecti نَمْ q. v.).

لَمْ actus dandi; مَدَدْ actus dandi et recipiendi:
commercium.

لَمْ , fut. لَمْ præpondera-
vit, inclinavit bilanx; c. نَمْ ,
pluris fuit, pluris valuit, præ-
polluit. Part. act. لَمْ præ-
ponderans. Part. pass. لَمْ ;
active usurp. præponderans.

Pa. لَمْ præponderare fecit;
trop. præcellentiam dedit.

Ethpa. لَمْ لِ inclinatus est,
demissus est.

Aph. لَمْ لِ et لَمْ لِ præponderare
fecit, inclinare vel declinare
fecit.

لَمْ , pl. لَمْ inclinatio
stateræ, præponderatio; mo-
mentum, propensio.

لَمْ et لَمْ id.

لَمْ inclinare faciens sta-
teram.

لَمْ præcellentia.

لَمْ inclinatus, propensus.

لَمْ præponderatio, pro-
pensio.

لَمْ . fut. نَمْ , imper.
نَمْ , inf. مَدَفْ et مَدَفْ ,
traxit, attraxit, distraxit;

recepit, extraxit, *speciat. seq.*
רָמַת; *cfr. ar.* **רָמַת** traxit,
 evulsit *pilos*, etc. **וְלֹא** **רָמַת**
 ad se traxit. *Part. pass.*
רָמַת; *adj.* rapidus.

Ethpe. **וְלֹא** **לִי** attractus est;
trop. illectus est, abreptus est.

Pa. **וְלֹא** *ut Pe.-Part. pass.*
וְלֹא; distentus *curis*.

Ethpa. **וְלֹא** **לִי** *ut Ethpe.*

וְלֹא attractio; evulsio.

וְלֹא **וְלֹא** trahens, attractivus;
 destillans.

וְלֹא **וְלֹא** tractio, attractio.

וְלֹא **וְלֹא** *id.*

וְלֹא attractio, distractio;
in pl. avocamenta mentis.

וְלֹא **וְלֹא** attrahens.

וְלֹא **וְלֹא** attractus.

וְלֹא, *ar.* **רָמַת**, *fut.* **וְלֹא**, de-
 cedit *folium arboris*, *capillus*
etc., defluxit; tabuit; *cfr.*
heb. **נָהָר** subsiliit. *Part.*
præs. **וְלֹא**, **וְלֹא**; decidens,
 defluens. - *Part. præt.* **וְלֹא**,
וְלֹא defluxus, delapsus; *it.*,
al. **וְלֹא**, oblitteratus.

Ethpa. **וְלֹא** **לִי** depilatus est.
Aph. **וְלֹא** **לִי** decidere fecit, excus-
 sit, ejecit.

וְלֹא excussio, defluxio, deci-
 dum.

וְלֹא deciduum quid, *inde mica* ;
 particula, granum; *it.* nit-
 rum, *νίτρον*, *heb.* **נָהָר**, *ar.*
نَطْرُون, *id.*; papaver.

וְלֹא **וְלֹא** *dim.*, decidua particula.

וְלֹא **וְלֹא** excussio, defluxio; deci-
 dum quid.

וְלֹא **וְלֹא** deciduus.

וְלֹא *heb.* **נָהָר**, *fut.* **וְלֹא**
 evulsit, exstirpavit; dilace-
 ravit; extraxit, desumpsit;
 excerptis *sententias*; *cfr. ar.*
וְلֹא *נָשֶׁשׁ* extraxit *spinam*, etc.

Ethpe. **וְלֹא** **לִי** avulsus est,
 dilaceratus est.

Pa. **וְלֹא** evulsit, dilaceravit;
 distendit *mentem cura*.

Ethpa. **וְלֹא** **לִי** *pass.*

וְלֹא evulsio, laceratio; *it.* cin-
 cinnus.

וְלֹא laceratio, extraxio.

וְלֹא, **וְלֹא** separatio, avulsio;
in pl. excerpta; *trop.* **וְלֹא** **וְלֹא**

וְלֹא **וְלֹא** *carnis dilaceratio*: de-
 tractio, *cfr.* **וְלֹא** **וְלֹא** calum-
 niavit.

וְלֹא **וְלֹא** evulsus, exstirpatus.

וְלֹא **וְלֹא** exstirpatio, evulsio.

100

هَلَّا, fut. **هَلَّا**, senuit;

1^a p. مُهَاجِرٌ consenui; nnq.
excidit Aleph: مُهْجَرٌ consenui-
 mus; *cfr. heb.* מַחְרֵב, *ar.* شَابَ,
 يَشَيْبَ canus factus est *capillus*;
 senuit. *Part. præs.* مُهَاجِرٌ,
 subst. vide *infra*.

Aph. اصلیٰ consenuit.

مُهَادًا , مُهَادٌ et communius مُهَادٌ ,
 مُهَاتَةً , مُهَاتٍ , f. مُهَاتَةً , مُهَاتٍ , f.
 senex ; avus ; titulus honoris,
 id. q. ar. شِيَخٌ , vir venerabilis,
 senior. مُهَاتَةً وَمُهَادًا seniores
 urbis ; it. cognomina effor-
 mat : مُهَادًا وَمُهَاتَةً Avicenna,
 (ar. الشِّيَخُ الرَّئِيس).

مَحْتَلٌ, pl. **مَحْتَلَاتٍ** anus, ava.

نarrationes ineptæ anuum: ani-
les fabulæ, næniæ.

سَنِيلِي senilis; *trop.* antiquus.

سَيِّرَةً , cfr. ar. شَيْرَةٌ ; it. senatus.

حَسْنَةٌ et f. **حَسْنَةٌ** cani capilli.

مُحَمَّدٌ et **مُحَمَّدٌ** anilis.

مَكَالِمٌ σάββατον , pl. مَكَالِمٌ sabbatum ; hebdomada.
 مَلَامِيدٌ σεύρα , lacerta.
 مَلَامِيدٌ , v. s. مَلَامِيدٌ .
 مَلَامِيدٌ سَارْتُرِيُون , saturion
planta (gall. orchis).
 مَلَامِيدٌ , heb. تَنْتَر , tentorium.
 مَلَامِيدٌ , ar. سَكَرْ , saecharum.
 مَلَامِيدٌ , i. q. مَلَامِيدٌ .
 مَلَامِيدٌ σέλινον , apium *planta*
(gall. ache).

مَلَامِيدٌ , s. pl. argentum; cfr.
 pers. سَبَقْ id. مَلَامِيدٌ plum-
 bum. مَلَامِيدٌ مدْنَمٌ stannum.
 مَلَامِيدٌ argenteus.
 مَلَامِيدٌ obductio cum argento.

مَلَامِيدٌ , fut. مَلَامِيدٌ ,
 imper. مَلَامِيدٌ se calceavit, c.
 vel s. مَلَامِيدٌ . Part. præs.
 مَلَامِيدٌ . Part. præter.
 مَلَامِيدٌ , مَلَامِيدٌ .

Ethpa. مَلَامِيدٌ calcæis indutus est.
 Aph. مَلَامِيدٌ calcæavit, induendos
 dedit calceos, c. acc. pers. et
 rei.

مَلَامِيدٌ et مَلَامِيدٌ , heb. צָרִיךְ , chald.
 سَرِينَى , pl. مَلَامِيدٌ calceus.

مَلَامِيدٌ stomachus ruminantium ;
 cfr. مَلَامِيدٌ , s. l.

مَلَامِيدٌ , v. s. مَلَامِيدٌ .
 مَلَامِيدٌ مَلَامِيدٌ calceatio.

مَلَامِيدٌ et مَلَامِيدٌ , pl. مَلَامِيدٌ cal-

ceus ; مَلَامِيدٌ solutus cal-
 ceis : discalceatus.

مَلَامِيدٌ ut مَلَامِيدٌ , v. s. مَلَامِيدٌ .
 مَلَامِيدٌ et مَلَامِيدٌ σάνδυξ et
 σάνδιξ , sandix seu cerussæ
 species.

مَلَامِيدٌ συνώνυμος , synony-
 mon.

مَلَامِيدٌ , v. s. مَلَامِيدٌ .

مَلَامِيدٌ σούσιον , oleum ex li-
 lio expressum, cfr. ar. سُوْسَن
 lilium.

مَلَامِيدٌ σηπία , sepia piscis
(gall. seiche).

مَلَامِيدٌ , v. s. مَلَامِيدٌ .

مَلَامِيدٌ σάπφειρος , sapphirus ;
 cfr. مَلَامِيدٌ .

مَلَامِيدٌ σαπρότης , vermicu-
 latio ; scobs.

مَلَامِيدٌ vox latina, saccus,
 cilicium.

مَلَامِيدٌ σεραپιا̄ς , serapias
planta.

مَلَامِيدٌ مَلَامِيدٌ τεσσαρακοστή ,
 quadragesimale jejunium.

مَلَامِيدٌ σάρδιον , sardus
 gemma.

مَلَامِيدٌ σέρις , seris (*gall.* endive, chicorée).

مَلَامِيدٌ et rectius مَلَامِيدٌ σάρος , caro.

مَلَامِيدٌ , v. s. مَلَامِيدٌ .

مَهْ, ar. شَبَّ, fut. مَهْ arsit, ebullivit.

مَهْ, imp. v. مَهْ

مَهْ spuma juris.

مَهْ inguen.

مَهْ, fut. مَهْ, vix usitat.; cfr. ar. شَيْءٌ similis fuit.

Pa. مَهْ ut usitatius Aph.

Ethpa. مَهْ similis factus est.

Aph. مَهْ assimilavit, repræsentavit. Part. pass. مَهْ, مَهْ; similis.

Ettaph. مَهْ pass.

مَهْ similitudo.

مَهْ similitudo.

مَهْ similitudo.

مَهْ similitudo.

مَهْ verisimiliter.

مَهْ similitudo; conformatio, imitatio.

مَهْ assimilans, similitudinem inducens.

مَهْ assimilatio, conformatio.

مَهْ caro salita.

مَهْ, ar. طَبَّ et pers. سَبَّ, corbis.

مَهْ caro salita et succisa.

مَهْ, heb. מַהְלָה, ar. شَيْءٌ, im-

plexus est, se implexuit, fut.

مَهْ et مَهْ impegit, se immisit, irrepsit, subiit aqua;

adhæsit, inhæsit, se infixit, se complexuit, amplexus est, c.

مَهْ vel مَهْ, impetiit, aggressus est, irruit in., c. variis particulis, spec. c. مَهْ vel مَهْ; contendit, ausus est, ascendit;

مَهْ occurit ei obviam. مَهْ مَهْ لَهْوُ مَهْ montis ascensum aggressus est.

Part. act. مَهْ, مَهْ, aggressiens, adhærens, etc.

إِنْ مَهْ مَهْ مَهْ ille qui contendit secreta explicare.

Part. pass. مَهْ, مَهْ, adhærens; collectus.

Ethpe. مَهْ adhæsit.

Pa. مَهْ adhæsit; infixit, applicuit, immisit; ascendit.

مَهْ infilio, adhæsio; it.

mitra, velum reticulatum mulierum; cfr. شَبَّ rete.

مَهْ adhærens, viscosus.

مَهْ adhærens.

مَهْ adhærentia; ascensio.

مَهْ id.

مَهْ, fut. مَهْ bajulavit, tulit, attulit; trop. toleravit, passus est. Part. pass.

مَهْ; act. patiens.

Ethpe. لُخْدَهِ pass.

Pa. لُخْدَهِ ferendum curavit, as-
portare fecit; *dolorem* inflixit.
affixit.

Aph. لُخْدَهِ inflixit, vexavit.
مَحْلَهِ vectio frugum.

مَهْدَهِ toleratio, patientia.
مَحْلَهِ, i. q. مَحْلَهِ, ar. شَبَلْ, spica.
مَهْدَهِ qui portat; vector spi-
carum, *spec.* ad aream.

مُهْدَهِكْمَا vectio frugum ad
aream.

مَهْكَمَا patientia.

مَهْلَهِ storea.

مَهْكَهِتَهِ dona sponsalitia.

مَهْدَهِهِ سِبِيلْ, Sybilla.

مَهْلَهِ, pl. مَهْلَهِهِ scala;
cfr. *mandaeum.* מַדְבָּלָה, et
ar. مَهْلَهِ, neo-syr. مَهْلَهِ; it.
genus carminum.

مَهْمَهَهِ, *cfr.* סִמְבֹּולֶה, pars,
portio, collatio voluntaria,
contributio sponte collecta,
symbolæ (*gall.* pique-nique);
it. *sed rectius* مَهْمَهَهِ, symbo-
la, signa. لِيْلَهِ مَهْمَهَهِ locus ubi
congregantur ad symbolas.

مَهْمَهَهِنَهِ patientia.

مَهْمَهَهِ et مَهْمَهَهِ, *pler. in part.*,
usurp. abundavit, crevit. *Part.*
act. مَهْمَهَهِ abundans. *Part.*
pass. adject. usurpat. *v. infra.*

Ethpe. مَهْدَهِ densus fuit.

Pa. مَهْمَهَهِ multiplicavit; مَهْمَهَهِ
مَلْ valde replevit.

مَهْمَهَهِ, مَهْمَهَهِ spissus, den-
sus; frequens, multus, abun-
dans, continuus; gramm. af-
fixus. مَكْنَهِهِ دَهْرَهِ vel
مَهْمَهَهِ, arbor frondosa.
مَهْمَهَهِ مَهْمَهَهِ pycnocomon
planta (*gall.* scabieuse).

مَهْمَهَهِ frequenter, continuo;
gramm. conjunctim *scripta*
verba, ut بِلْ, ex جَ and بِ.

مَهْمَهَهِ frequentia, densi-
tas, abundantia; continuitas;
gramm. affixio. لَهْمَهِهِ
مَعْنَهِهِ angustia respirationis.
مَهْمَهَهِ مَلْ raucitas; adv.
مَهْمَهَهِ frequenter, continuo.

مَهْمَهَهِ, pers.-ar. سَبَسْتَانِ, my-
xa arbor (*gall.* sébestier).

مَهْمَهَهِ et مَهْمَهَهِ τεβαστός,
augustus.

مَهْمَهَهِ vox lat., subsellium.

✓

مَهْمَهَهِ, heb. נֵשֶׁת, ar. شَبَّهَ, fut.

مَهْمَهَهِ satiatus est, seq.
accus. vel بَ, وَ, aut مَهْمَهَهِ, sa-
tur fuit; copiose, plene fruitus est. *Part.* præs. مَهْمَهَهِ
مَهْمَهَهِ; مَهْمَهَهِ satur sum,
contr. pro بِلْ مَهْمَهَهِ. *Part.*

- præt.* مُحْدَّثاً ; abundans.
Ethpe. مُحْدَثاً ; satiatus est, ad satietatem usque crevit ;
trop. molestatus fuit, c. مُ .
Pa. مُحَدَّثاً satiavit. *Part. pass.* مُحَدَّثاً , مُمْهَدَّثاً satiatus, satur ; plenus, abundans.
Ethpa. مُحَدَّثاً *pass.* ; *trop.* molestiæ fuit.
Aph. مُحَدَّثاً satiavit ; perfecit. .
ar. مُحَدَّثاً ar. شَبَّةٌ satietas ; ubertas ; *adj.* مُحَدَّثاً , مُحَدَّثاً , ar. شَيْءٌ , satur.
مُحَدَّثاً , مُحَدَّثاً satur.
مُحَدَّثاً ad satietatem usque ; c. مُ insatiabiliter.
مُحَدَّثاً , مُحَدَّثاً satietas, ubertas; *adject.* c. *præc.* , satians.
مُحَدَّثاً satietas ; preces liturgicæ cœnam subsequentes ; Completorium. حُدَّه مُحَدَّثاً cœnaculum.
مُمْهَدَّثاً satians ; gramm., nomen accentus.
فَعْلًا مُمْهَدَّثاً satiabilis. فَعْلًا مُمْهَدَّثاً inexhausta fames.

ص, fut. مُحَدَّثاً opinatus est, judicavit ; censuit, existimavit, conjectavit ; *aliquid pro alio* habuit. حُكْمَهَا أَكْتَنَا
ص creaturas uti deos reputant ; *cfr.* ar. شَيْءٌ men- suravit, et سَيْرٌ exploravit.
Part. act. مُحَدَّثاً ; مُحَدَّثاً id. q. اِنْتَ مُحَدَّثاً puto. اِنْتَ مُحَدَّثاً ne credas. *Part. pass.* مُحَدَّثاً مُحَدَّثاً reputatus ; falso præsumptus, fictus.
Ethpe. مُحَدَّثاً existimatus est, conjectatus est ; reputatus est ; *impers.* لَحَدَّه مُحَدَّثاً visum est. كُنْدَه لَهُ مُحَدَّثاً tibi videtur quod.
Pa. مُحَدَّثاً præsumpsit, speravit ; c. م pers., in aliquo confidit ; it. annuntiavit, evangelizavit, ar. بَشَّرَ ; opinatus est.
Ethpa. مُحَدَّثاً annuntiatus est, nuntium accepit, evangelizatus est ; visum est.
Aph. مُحَدَّثاً id. q. Pe. censuit ; suspicatus est, suspicionem movit ; annuntiavit, promisit ; exspectavit.
فَهُدَه مُحَدَّثاً , مُحَدَّثاً spes ; مُحَدَّثاً desperavit. بَعْدَ مُحَدَّثاً spe frustatus est. بَلْ مُحَدَّثاً absque spe ; præter opinionem.
مُحَدَّثاً opinio, conjectura. مُحَدَّثاً id. ; مُحَدَّثاً اَوْسِرَا recta opinio : orthodoxyia.
مُحَدَّثاً imaginarius.
لَهُ مُحَدَّثاً opinio ; phantasia, illusio.
مُحَدَّثاً , f. st. c. لَحَدَّه مُحَدَّثاً , pl. مُحَدَّثاً , pl. مُحَدَّثاً , f. st. c. لَحَدَّه مُحَدَّثاً , pl. مُحَدَّثاً , nuntius spec. felix, ar. شَيْرٌ ;

annuntiatio, prædicatio ; lec-
tio publica Evangelii ; it. m.,
Evangelium. مَهْ مَهْ pri-
maria evangeliorum : evange-
lia undecim ad Resurrectio-
nem spectantia. مَهْ absol.
vel مَهْ مَهْ sabbatum
annuntiationis : Sabbathum
Sanctum.

مَهْ annuntiatio, prædicatio ;
tempus ecclesiasticum Ad-
ventus.

مَهْ qui nuntium affert,
nuntius ; præco, spec. evan-
gelista.

مَهْ praconis more, ad
instar fausta prædicantis.

مَهْ annuntiatio ; exspec-
tatio ; suspicio, opinio.

مَهْ ex conjectura.

مَهْ , pl. مَهْ opinio,
suspicio.

Paial مَهْ , nnq. مَهْ susti-
nuit, pertulit ; c. مَهْ vel مَهْ ,
pers. moram concessit alicui,
tardavit ; exspectavit, se con-
tinuit ; continuit ; c. مَهْ rei
abstinuit ; cfr. صَرْ patien-
tia, robur.

Ethpaial مَهْ toleratus est ;
cibo roboratus est, victum
sumpsit.

مَهْ victus, alimentum.
مَهْ patiens, abstinentia.
مَهْ patientia, abstinen-
tia ; c. مَهْ , impatientia.
مَهْ tolerabilis ; c. مَهْ intolerabilis.
مَهْ cum tolerantia ; mo-
derate ; c. مَهْ sine moderamine.
مَهْ , v. s. مَهْ .

مَهْ et مَهْ , heb. שָׁנָה
fut. مَهْ crevit, multiplicat-
us est. Part. præs. مَهْ ,
مَهْ .

Pa. مَهْ cecinit, cantibus
laudavit ; cfr. ar. شَجَّ can-
tibus grate movit aliquem.

Ethpa. مَهْ pass.

Aph. مَهْ crescere fecit, mul-
tiplicavit ; c. al. verbo *equi-valet adverb.* : multum, valde,
nimium. مَهْ مَهْ multum
locutus est. مَهْ مَهْ constanter
pulsabo. مَهْ multa injuria cum affice ; it.
c. o , مَهْ مَهْ eos
sæpe vocavit ; gramm. in
plurali usurpavit nomen.

Ettaph. مَهْ pass.

مَهْ , emph. مَهْ et مَهْ , f.
emph. مَهْ مَهْ , st. c. لِمَهْ ,
pl. مَهْ مَهْ , مَهْ مَهْ , f.
مَهْ مَهْ multus,

præc. vel *subseq.* nomine: **حَتَّىٰ** multi homines. **مُكْثُلًا** magnus exercitus; gramm., pluralis; *in pl.* multi, multitudo (*οἱ πολλοί*); *it.* *forma pluralis inservit spec. in st. c. ad reddenda superlativa et nomina græca* **أَنْوَدُ** composita; **مُهَدِّدًا** **أَنْوَدُ** πολυλογία, multiloquium. **مُهَمَّاتٍ**, *pl.* **مُهَمَّاتٍ** πολύπους, polypus. **مُهَمَّاتٍ** πολύθεοι, polytheistæ. **مُهَمَّاتٍ** multiformis. **مُهَمَّاتٍ** multicolor. **مُهَمَّاتٍ** περίτυρπος, robustissimus. **مُهَمَّاتٍ** lucidissimus. **مُهَمَّاتٍ** beatissimus. **مُهَمَّاتٍ** plenus cura: sollicitus; *c.* **مُهَمَّاتٍ** comparat. **مُهَمَّاتٍ** numero superiores; *adverb. in stat. abs.* multus, multi; multa, multum; nimium. **مُهَمَّاتٍ** multa bella. **مُهَمَّاتٍ** res multæ. **مُهَمَّاتٍ** viduae multæ. **مُهَمَّاتٍ** pisces multi. **مُهَمَّاتٍ** وَبِرْدَةً دَهْرَةً multum potuit venumdari multo. **مُهَمَّاتٍ** hæc pauca ex multis. **مُهَمَّاتٍ** multum gavisus est; *nng. in st. emph.* **مُهَمَّاتٍ** valde contrastatur.

locut. *adverb.* **مُهَمَّاتٍ** a fortiori; **مُهَمَّاتٍ** ad summum; *it.* *conunct.* quamvis. **مُهَمَّاتٍ** multitudo; gramm., pluralis. **مُهَمَّاتٍ** πολυγαμία polygamia. **مُهَمَّاتٍ** valde, magis. **مُهَمَّاتٍ** *vel* **مُهَمَّاتٍ** multo; *in statu plurali.* **مُهَمَّاتٍ** numerus pluralis. **مُهَمَّاتٍ** pluralis. **مُهَمَّاتٍ**, *et communius* **مُهَمَّاتٍ** *st.* *c. f.* **مُهَمَّاتٍ**, *c. aff.* **مُهَمَّاتٍ**, *vel* **مُهَمَّاتٍ** etc. multitudo; major pars; *adverb.* multum; **مُهَمَّاتٍ** *id.*, *cfr.* **مُهَمَّاتٍ**; **مُهَمَّاتٍ** multum magnanimitatis. **مُهَمَّاتٍ** opes multæ. **مُهَمَّاتٍ** communiter, plerumque. **مُهَمَّاتٍ**, *pl.* **مُهَمَّاتٍ** carmen; canticum, hymnus; *cfr. ar.* **مُهَمَّاتٍ** cantus lenis. **مُهَمَّاتٍ** stola. **مُهَمَّاتٍ** cantator; laudator. **مُهَمَّاتٍ** crescere faciens, multiplicans. **مُهَمَّاتٍ** cantatio. **مُهَمَّاتٍ** multiplicatio. **مُهَمَّاتٍ**, *fut.* **مُهَمَّاتٍ**, *heb.*

סָגֵד, ar. سَجَدَ, se humiliiter inclinavit, inde salutavit, adoravit, c. ». Part. act. מְהֻרָב; מְהֻרָב חַמּוֹם adorator solis: heliotropium planta. Part. pass. מְהֻרָב, מְהֻרָב adoratus; venerandus, adorandus; augustus; it. optative מְהֻרָב. מְהֻרָב Dominus cui adoratio fiat (ar. السَّجُود).

Ethpe. מְהֻרָב pass.

Aph. מְהֻרָב colere, adorare fecit.

מְהֻרָב adoratio, veneratio; cultus. מְהֻרָב וְחַמּוֹת idolatria. מְהֻרָב locus adorationis, sacellum; seq. תְּמִזְוָן pyreum.

מְהֻרָב more adorantis.

מְהֻרָב adorator, cultor.

מְהֻרָב, ar. مَسْجِد, templum Mahumedianorum (gall. mosquée).

מְהֻרָב adorandus, cui cultus reddendus est.

רָכֶם, מְהֻרָב racemus, botrus; cfr. heb. רָכֶם; metaph. cinni; it. arcturus stella.

קַלְעָה cyperus.

נַמּוּלָרִיוס nummularius; cfr.

נַמּוּלָרִיוס.

לְאַנְגָּלִים, pl. לְאַנְגָּלִים lancea.

מְלַט, fut. نَعْمَل læsit, oppressit, cfr. ar. شَجَب afflictit. Part. pass. מְלַט, מְלַט læsus, afflictus; מְלַט חַمּוֹם pedibus impotens. מְלַט תְּמִזְוָן lumine privatus: cæcus.

Ethpe. מְלַט pass.

Pr. מְלַט læsit, damno affecit, nocuit.

Ethpa. מְלַט pass.

מְלַט mutilatio.

מְלַט læsio, afflictio, multatio, læsio, detrimentum, injuria.

מְלַט, מְלַט afferens, noxius.

מְלַט læsio, injuria, damnum.

מְלַט, fut. نَعْمَل clausit, occlusit; trop. cohibuit, interdixit; cfr. סָגֵד, heb. סָגֵד id. ar. زَجَر cohibuit a, et תְּקַרְבָּה obturavit.

Ethpe. מְלַט clausus est, cohibitus est.

Ethpa. מְלַט id.

מְלַט cohibitio, obex; it. ut seq.

מְלַט heb. סָגֵר, imber abundans; cfr. ar. سَجَر aqua alveum fluminis implens.

- | | |
|---|--|
| ال كالigo ; it. diluvium. | مَعْصِمٌ scissus, fissus : schismaticus. |
| ال راموس, cfr. شجرة arbor. | Ethpe. مَعْصِمٌ pass. ; schisma fecit. |
| ال collarē ligneum canum ; cfr. ar. ساجور id. | Pa. مَعْصِمٌ scidit, laceravit : separavit, divisit ; sectam formavit ; trop. sibi viam fudit. |
| ال spelunca ; clivus ; arboris nomen, cfr. متن id. | Ethpa. مَعْصِمٌ pass. |
| ال planta aquatilis. | ما scissio, schisma, hæresis, secta ; chartæ laceratæ fragmента. |
| ال cippus, compes : cfr. ar. شد ligavit ; it. fenum, cfr. اول ; it. ut seq. | ما scissio, laceratio. |
| ال spatium centum passuum, pers. شد centum. | ما lacerans, lacerator ; schismatis auctor. |
| ال saccus e corio confectus ; corbis. | ما scissio ; dissensio. |
| ال sandalium. | ما discordia. |
| ال sodomiticus. | ما scissura. |
| ال sodomitice. | ما qui scindi potest. |
| ال et sodomiae crimen. | ما adv. ; c. ی indivisibiliter. |
| ال et sindon sindon, cfr. סינדונ, linteam, perizoma. | حبيه fut. نفعه heb. נְעָמָה, disposit, ordinavit ; c. vel s. aciem ordinavit ; ordinatim exposuit, narravit, recitavit ; metrico ordine disposit ; intrans. in serie stetit, contigit. حبـه حـلـه حـلـوكـه decrevit in corde suo se orandum. |
| ال , pers. سـنـه , ar. سـنـدان , incus ; rota. حـبـه حـلـه prasium planta (gall. origan). | Ethpe. حـلـه pass. et refl. |
| ال , ar. سـنـس , pars sexta. | Pa. حـلـه ordine disposit. |
| ال , et حـبـه , fut. حـبـه , scidit, disrupt ; cfr. ar. شـدـه id. ; trop. se divisit, se separavit ; schisma fecit ; cfr. ar. شـقـه id. Part. pass. حـبـه , | Ethpa. حـلـه pass. |
| | Cedr. سـطـرـه , et حـبـه , حـبـه , cfr. سـطـرـه , op. |

do, series; acies, turma; oratio liturgica rythmica quæ inter Sacrificium recitatur; it. velum; ar. ستر; c. ٹ, adv. in ordine, deinceps, مَنْتَهِيَّا حَسْتَ حَبْرَةً milites ejus.

مُهْبَطٌ ordinans.

مُهْبَطٌ arum planta (*gall. serpentaire*); cfr. ar. سدر.

مُهْبَطٌ ordinatim.

مُهْبَطٌ dispositio, instructio aciei; series.

مُهْبَطٌ σουδάριον, sudarium; linteum, ar. شُوذر; cedaris, (*gall. turban*).

مُهْبَطٌ velum muliebre.

مُهْبَطٌ abacus sustinendo lampadi destinatus.

مُهْبَطٌ centurio, a pers. مَنْ centum.

↑

جَهْدٌ, ar. جَهْدٌ, fut. جَهْدٌ, testis fuit, testatus est. *Part. act.* جَهْدٌ, emph. et subst. جَهْدٌ, f. جَهْدٌ, pl. جَهْدٌ, c. suff. جَهْدٌ, جَهْدٌ, جَهْدٌ, testis; martyr. جَهْدٌ locus quo conduntur ossa martyrum, templum. *Part. pass.* جَهْدٌ, جَهْدٌ testimonio notus, probatus; clarus.

Ethpe. جَهْدٌ testimonio confirmatus est.

Pa. جَهْدٌ testes invocavit; testificatus est, obtestatus est.

Ethpa. جَهْدٌ testibus comprobatus est; martyrium passus est, ar. اسْتَقْبَدَ.

Aph. جَهْدٌ testimonium dedit; sanguine testatus est, inde martyr fuit; it. testificatus est, obtestatus est.

Ettaph. جَهْدٌ in testimonium invocatus est.

جَهْدٌ, مَلْجَهْدٌ, pl. مَلْجَهْدٌ et مَلْجَهْدٌ obtestatio; testimonium. مَلْجَهْدٌ مَكْثَرٌ martyria.

جَهْدٌ testimonialis, ad martyrium vel martyrem pertinens.

جَهْدٌ testificatio.

جَهْدٌ id.; testimonium.

جَهْدٌ in testimonium adductus.

جَهْدٌ ap. alchim. ferrum.

جَهْدٌ سِنْفُونِيَّ مَسْتِيلِيَّ sextilis mensis, Augustus.

جَهْدٌ سِلْيَانِيَّ اپِيُومُ apium planta. جَهْدٌ سِلْيَانِيَّ سِسَلِيَّ seselis herba.

جَهْدٌ pro جَهْدٌ, ar. جَهْدٌ, vigiliavit.

جَهْدٌ, جَهْدٌ c., luna, ar. جَهْدٌ, mensis lunaris; trop. argentum.

جَهْدٌ v. denom., incepit lucere nova luna.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا lunaris ; حَفَّةٌ مَّدَّا anni lunares.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا lunaris, lunæ venustate similis. حَفَّةٌ مَّدَّا pulchra ut luna ; it. lunaticus.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا dim., lunula, ornamen-tum ad formam crescentis lunæ, heb. לְחָנִינָה .

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا , حَفَّةٌ مَّدَّا lunaticus.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا , v. حَفَّةٌ مَّدَّا .

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا سَرْجِيَّةٌ , artemisia (gall. armoise).

لُنَتِمْ , fut. حَفَّةٌ مَّدَّا desideravit, exoptavit, c. حَشْ . cfr. ar. شَحْ . Part. act. حَفَّةٌ مَّدَّا . Part. pass. حَفَّةٌ مَّدَّا , pl. حَفَّةٌ مَّدَّا activo sensu exoptans ; adj. cupidus.

Ethpe. لُنَتِمْ ut Pe.

Aph. لُنَتِمْ exoptare fecit, de-siderio affecit; لُنْتِمْ حَفَّةٌ مَّدَّا ejus desiderium in eo movit.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا desiderium, cupido.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا id.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا , pl. حَفَّةٌ مَّدَّا odor, spec. adipis in holocaustis ; per ex-tens. sacrificium, hostia, holocaustum, cfr. ar. شَوَّى assa-vit.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا adiposus.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا θύριος , thuris species.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا inus. ; cfr. ar. شَبَابَ يَشُوبُ , شَابَ miscuit ; decepit.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا polluit, contaminavit.

Part. act. حَفَّةٌ مَّدَّا coinquinans.

Part. pass. حَفَّةٌ مَّدَّا , f. emph. حَفَّةٌ مَّدَّا , pl. f. حَفَّةٌ مَّدَّا pollutus ; impurus, profanus, turpis.

Ethpa. لُنَتِمْ pass. et refl.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا pollutio, profanatio ; abominatio.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا , v. s. حَافَ .

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا , pl. حَفَّةٌ مَّدَّا σιβύντη , jaculum, spiculum.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا contaminatio.

لُنَتِمْ , heb. حَسْ ar. سَاجَ , sepivit, clausit ; trop. cohibuit ; seq. حَسْ obturavit scis-suras. Part. act. حَسْ , تَحْسِيْه . Part. pass. حَسْ , تَحْسِيْه .

Ethpe. لُنَتِمْ pass.

Pa. حَسْ septo munivit, circumsepsit.

Aph. حَسْ id. ; seq. حَسْ reparavit.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا , ar. سِيَاجَ , sepes, septum ; limes ; حَسْ حَسْ reparatio ruinarum.

لُنَتِمْ حَفَّةٌ مَّدَّا septum ; claustrum, cœnobium.

لـ	reparans ruinas, scis- suras.	وـ مـ وـ ، vale.
لـ مـ	compedes.	مـ مـ ، fut. مـ مـ cupivit ; expetivit, grate exceptit ; il- lexit res, cfr. مـ مـ . مـ مـ لـ مـ حـ دـ ardenter prorupit ei ob- viam. Part. act. مـ مـ مـ مـ . Part. pass. مـ مـ ، مـ مـ tabescens.
لـ	ar. سـاجـ , populus nigra.	Pa. مـ مـ cupivit ; delectavit.
لـ بـ	inus., cfr. ar. سـادـ et secreto collocutus est, et آشـادـ vocem extulit.	Ethpa. مـ مـ id. q. Pa.
لـ	مـ مـ وـ مـ وـ et مـ مـ وـ مـ colloquium, ar. سـوـاـدـ ; loquela, lingua ; it. turba, ar. سـوـاـدـ , cfr. heb. כـ , concilium.	مـ مـ diffusio, cfr. ar. سـاجـ flu- xit ; natatio, cfr. مـ مـ .
لـ	Pa. مـ مـ v. denom., collocutus est, confabulatus est.	مـ مـ ardenter, avide.
لـ	Ethpa. وـ مـ حـ ut Pa., c. مـ vel خـ pers. ; it. pass. interpel- latus est.	مـ مـ et مـ مـ مـ cupido ; alaci- tas, promptus animus.
لـ	Ettaph. مـ مـ مـ dictus est.	مـ مـ مـ desiderans.
لـ	مـ مـ وـ مـ et مـ مـ وـ مـ mensura frumenti.	مـ مـ مـ desiderium.
لـ	مـ مـ مـ ad loquelam spectans, compellativus.	مـ مـ ، ar. شـيـحـ , abies.
لـ	مـ مـ وـ مـ narrativus.	مـ مـ cupido ; it. putredo.
لـ	لـ مـ مـ مـ narrativus ; لـ مـ مـ مـ non reputati ut adulatores.	مـ مـ lavatio ; cfr. مـ مـ .
لـ	مـ مـ وـ مـ ، ar. مـ مـ وـ مـ , Nigri, cogno- men Abbasidarum nigris ves- tibus indutorum.	مـ مـ urinator (gall. plongeur).
لـ	مـ مـ وـ مـ etc., v. s. مـ مـ .	مـ مـ alacriter, animo li- benti.
لـ	لـ مـ مـ ، ar. سـوـيلـ , canopus stella.	مـ مـ desiderium, affectio, cupido.
لـ	لـ مـ مـ مـ مـ مـ سـعـيـخـ , pl. مـ مـ مـ مـ مـ conjunctio.	مـ مـ مـ desiderio afficiens.
لـ		مـ مـ مـ cupid.
لـ		لـ مـ مـ ، ar. شـاطـ ، fut. مـ مـ ، adustus est, arsit. Part. præs. مـ مـ ، مـ مـ ، ardens.
لـ		Pa. مـ مـ adussit.

Ethpa. حَمْدَةٌ adustus est ;
it. *trop.* flagello cæsus est,
cfr. ar. سَاطَ flagellavit, ex-
siccatus est.

حَمْدَةٌ flagellans.

حَسْهَا spithama ; pustula.

حَمْدَهُ ، حَمْدَهُ adustus.

حَمْدَهُ et حَمْدَهُ , it. حَمْدَهُ adustio, combustio.

حَمْدَهُ id.

حَمْدَهُ adustus.

حَمْدَهُ adustio.

حَمْدَهُ سَوَّاْجِرَهُ رَبِّيْن, Salva-
tor noster.

حَصَّ , fut. يَحْصُّ finivit, absolu-
vit ; *cfr.* حَصْ circumsep-
sit. Part. act. يَحْصُّ .
Part. pass. حَصُّ .

Pa. يَحْصُّ finivit, finibus con-
clusit, comprehendit, conti-
nuit ; definivit, determinavit ;
enumeravit, enuntiavit. Part.
act. حَصَّ حَلَّا ; حَصَّا , حَصَّا
omnia continens Deus. Part.
pass. لَا حَصَّا ; حَصَّا , حَصَّا
infinitus. حَصَّا حَصَّا
summatis.

Ethpa. يَحْصُّ pass.

حَصَّا حَصَّا finis, limes, summa ;
أَنْ حَصَّا in summa ejus ; uni-
versim. يَحْصُّ يَحْصُّ universim,
omnino. حَصَّا إِسْتَمَا

ultimos limites : summus,
immodicus. حَمْدَهُ uno verbo.
أَمْسِ وَحَمْدَهُ حَمْدَهُ ut sum-
matim dicam. حَمْدَهُ et sum-
matim ; et cætera. حَمْدَهُ ,
eatenus ; *nnq.* حَمْدَهُ *absol.*, in-
desinenter, *it. c.* لَا vel *abs.*
nequaquam, nullo modo ;
adverb. prorsus ; بِلَا sine
termino, sine fine ; innume-
rus, infinitus ; إِنْفَعْ مُهْلَهُ , ne
quis unquam. مَنْ لَا مُهْلَهُ nullo
modo ; nihil omnino. أَنْ مُهْلَهُ أَنْ vel
tandem ; مَعْ حَفْتَهُ vel حَمْدَهُ
omnino.

حَصَّ , v. s. حَصَّ .

حَصَّا , emph. حَصَّا , pl. حَصَّا ,
حَصَّا , heb. סַחָה , ramus ;
حَصَّا ; ar. مَسْوَكَهُ , dentifricium.

حَصَّ , ar. سَكَ , aroma ; it.
imper. v. يَحْصُّ .

حَصَّا dim., ramulus.

حَصَّا ramosus.

حَصَّا indefinite.

حَصَّا ultimus.

حَصَّا universalis.

حَصَّا finalis.

حَصَّا امْتَهَنَهُ ultimo, denique, tan-
dem.

حَصَّا امْتَهَنَهُ finis, absolutio ; uni-
versalitas.

حَصَّا , pl. حَصَّا حَصَّا finis, conclu-

sio, clausula ; summa. **אָמֵן** **אָמֵן** summatim, uno verbo ; *in pl.* clausulae *pre-*
cum.

אָמֵן limitate ; summatim.
אָמֵן limitatio ; comprehen-
sio ; *c.* **אָמֵן** immensitas.
אָמֵן sermonis comprehensio,
rhetorice figura.

אָמֵן comprehendens, limi-
tans.

אָמֵן comprehensio.

אָמֵן finitus ; *c.* **אָמֵן** im-
mensus, infinitus, *f.* **אָמֵן** ;
subst. metrum duodevigenti
syllabis in duplex hemisti-
chium divisus constans.

אָמֵן finite, determinate.
אָמֵן limitatio, compre-
hensio.

אָמֵן Sibylla.

אָמֵן etc., *pl.* **אָמֵן**,
אָמֵן, syllaba.
אָמֵן **אָמֵן**, index libri.
אָמֵן **אָמֵן** **אָמֵן**,
sylogismus.

אָמֵן *v. denom.*, conclusit,
collegit ; composuit ; scripsit.
Ethpalp. **אָמֵן** *pass.*

אָמֵן conclusio ; scriptio.
אָמֵן **אָמֵן** **אָמֵן**,
syllogisticus.

אָמֵן *et rarius* **אָמֵן**, heb.
אָמֵן et **שׁוֹם**, fut. **אָמֵן**, imper.
אָמֵן, infin. **אָמֵן**, posuit,
apposuit, imposuit ; reposuit,
depositus ; collocavit, consti-
tuit ; composuit *librum* ; pro-
tulit, citavit ; supposuit, pro-
certo posuit, affirmavit, aesti-
mavit. **אָמֵן** **אָמֵן** manum
intulit *contra*, *c.* **אָמֵן** ; it.
manum imposuit ordinando.
אָמֵן *vel* **אָמֵן** *faciem*
suam posuit : tetendit ad ;
trop. statuit, constituit. **אָמֵן**
אָמֵן *vel* **אָמֵן** *id.* **אָמֵן**
אָמֵן *apposuit mentem* : inten-
dit, attendit. **אָמֵן** *id.* **אָמֵן**
אָמֵן thus *Deo obtulit*.
אָמֵן **אָמֵן** insidias paravit.
אָמֵן pignus dedit
alicui. **אָמֵן** ministrum
vel diaconum constituit. **אָמֵן**
אָמֵן legem tulit. **אָמֵן**
אָמֵן *in throno seu in regno*
collocavit. **אָמֵן** pactum
iniit. **אָמֵן** *apposuit au-*
rem : obedivit. **אָמֵן**
fundamenta jecit. **אָמֵן**
fines statuit ; *c.* **אָמֵן**,
vel **אָמֵן** **אָמֵן** sibi proposuit,
inde inf. **אָמֵן** **אָמֵן** pro-
positum, conscientia, cogita-

tio; opinio, suspicio. مُهْمَّةٌ vel in principatu constituit, præposuit; it. in caput alicujus culpam, pœnas imposuit; castigavit, *inde* مُهْمَّةٌ vel مُهْمَّةٌ castigatio, pœna. مُهْمَّةٌ caput i. e. animam pro aliquo exposuit; c. حَدَّةٌ, insecurus est; c. حَدَّةٌ, imposuit *jussum*; attribuit rem; aestimavit. لَا مُهْمَّةٌ حَكَمْنَا nos magni non faciebant; it. adortus est, ar. مُهْمَّةٌ حَفَّةٌ على proposuit. مُهْمَّةٌ fugere cœperunt. مُهْمَّةٌ eum occidere proposuit. Part. act. مُهْمَّةٌ, مُهْمَّةٌ legislator. Part. pass. مُهْمَّةٌ, مُهْمَّةٌ stans, constans; مُهْمَّةٌ stet. مُهْمَّةٌ liber a tali compositus metrice. مُهْمَّةٌ حَلَّةٌ sibi proposuit ut; ap. gramm., præsens tempus; ap. grammaticos et logicos وَمُهْمَّةٌ ۚ ۚ aequivaleat suppositum, subjectum, (ar. مَوْضِعٌ).

Ethpe. مُهْمَّةٌ, nnq. مُهْمَّةٌ pass.; gramm. prædicatus est; مُهْمَّةٌ حَمَّةٌ in caput ejus imposita est culpa; c.

; حَدَّ vel حَدَّ i. q. Pe. c. his præp.

Pa. مُهْمَّةٌ vocalibus instruxit librum.

مُهْمَّةٌ, pl. مُهْمَّاتٌ positio, impositio; fundamentum; depositio, depositum, *inde* receptaculum, sepulchrum; impetus, invasio; compositio libri, legum, *inde* symbolum, systema; liber, scriptum, commentarius; plantatio, transplantatio; id quod apponitur igni, lignum; in pl. opuscula, litterarum monumenta; it. vocales. مُهْمَّةٌ أَمْبَاءٌ vel مُهْمَّةٌ impositio manuum, *inde* ordinatio, consecratio. مُهْمَّةٌ genuflexio. مُهْمَّةٌ قَلْلَةٌ stapes; apud gramm. vocalis; puncta pluralis; مُهْمَّةٌ قَبْرَمَهْمَّةٌ مُهْمَّةٌ præpositio.

مُهْمَّةٌ dimin., libellum. مُهْمَّةٌ positio, compositio; مُهْمَّةٌ حَتَّىٌ adoptio filiorum.

مُهْمَّةٌ positus; hypotheticus. مُهْمَّةٌ is qui ponit, componit, *inde* legislator, conditor, auctor libri; ordinator; affirmativus; it. hypotheticus.

مُهْمَّةٌ positio, impositio, compositio; adoptio filiorum;

gramm. propositio, affirmatio. لِسْنَةٌ لِسْنَةٌ legislatio.

أَمْهَدْ ، st. c. لِسْنَةٌ c. aff. مُهَمَّدْ ، مُهَمَّدْ vel مُهَمَّدْ etc. ، pl. لِسْنَةٌ id quod ponitur, spec. quod reconditur, inde thesaurus; statutum, constitutio; situs; plantatio. ثَسَارُوسْ thesaurus noster اَخْتَارْ adoptio patris. اَخْتَارْ adoptio filiorum. اَخْتَارْ capsula ossium i. e. reliquiarum (gall. châsse). بِبِلِوْثِيْكَا bibliotheca. اَخْتَارْ constitutio mundi; adv. دَفْعَةٌ in loco, pro. مُهَمَّدْ affirmativus. اَخْتَارْ ordinandus; positivus. اَخْتَارْ impositio.

أَرْبَعْ ، pl. لِسْنَةٌ ، corpus. اَرْبَعْ اَرْبَعْ ، incorporea.

أَرْبَعْ اَرْبَعْ et it. مُهَمَّدْ مُهَمَّدْ σύμβολον , symbolum, signum; dona regalia aliis regibus missa.

أَرْبَعْ ، ar. سَمْرَةٌ , merces proxenetæ.

أَرْبَعْ اَرْبَعْ συμπέρασμα , conclusio.

أَرْبَعْ مُهَمَّدْ ، σύμμαχον symphytum planta.

أَرْبَعْ مُهَمَّدْ συμπάθειا , sympathia, conjunctio. اَرْبَعْ مُهَمَّدْ et اَرْبَعْ مُهَمَّدْ vox ar. سُجَيْرَةٌ , navigii species.

أَرْبَعْ inus. ; cfr. ar. شَانَ inquinavit.

أَرْبَعْ مُهَمَّدْ lutum; trop. cœnum peccati; hæresis.

أَرْبَعْ مُهَمَّدْ lutosus.

أَرْبَعْ مُهَمَّدْ , id. q. بُوكَارْ , v. s. هَلْ .

أَرْبَعْ مُهَمَّدْ v. s. هَمْ .

أَرْبَعْ مُهَمَّدْ et اَرْبَعْ مُهَمَّدْ ، σύνοδος , forma abbrev. هَمْ , pl. اَرْبَعْ مُهَمَّدْ هَمْ synodus, concilium, cœtus; upud astron. conjunctio stellarum.

أَرْبَعْ مُهَمَّدْ συνοδίخ , asseclæ.

أَرْبَعْ مُهَمَّدْ مُهَمَّدْ συνοδίτης , synodita, Chalcedonio concilio adhaerens.

أَرْبَعْ مُهَمَّدْ et اَرْبَعْ مُهَمَّدْ مُهَمَّدْ συνοδικός , synodicus.

أَرْبَعْ مُهَمَّدْ مُهَمَّدْ συνοδικόν , synodicus; subst. synodicum.

أَرْبَعْ مُهَمَّدْ مُهَمَّدْ synodalis.

أَرْبَعْ مُهَمَّدْ مُهَمَّدْ σύνογος , continuus.

أَرْبَعْ مُهَمَّدْ et اَرْبَعْ مُهَمَّدْ συλλογισμός , syllogismus, ratiocinatio.

- | | | |
|---|-------------------------------|--|
| et | pl. | συμπέραχμα, pl. |
| συνώνυμος, synony-
mus. | | μερική μετά-
conclusio syllo-
gismi, id. q. مُعْدَّ. |
| συνώνυμία, synony-
mia. | | et مُكْلِمٌ et مُكْلِمٌ مُهْبِطٌ, pl.
συγκέλλος, syncellus. |
| et مُكْلِمٌ اعْصَى, it.
σύνταξις, syntaxis, dispositio ; compositio ;
in pl. orationes valedictoriae. | | الْفَرَكْلُوسُ et مُكْلِمٌ مُهْبِطٌ
σύγκλητος, consiliarius, se-
nator ; f. senatus. |
| συντάκτικός, compen-
diosus. | | الْفَرَكْلُوسُ مُهْبِطٌ
σύγκλητικός, senatorius. |
| συντάκτικός, συντάκτικος,
oratio, homilia valedictoria. | | الْفَرَكْلُوسُ مُهْبِطٌ
συγκρίτης, assessor. |
| συντάκτης, συντάκτης, id. | | الْفَرَكْلُوسُ et مُهْبِطٌ
συγκρότης, consociatio. |
| συντάκτικός, colloquium. | | الْفَرَكْلُوسُ مُهْبِطٌ
σύγκριτον, concilium. |
| συντέλεια, pl. | | الْفَرَكْلُوسُ مُهْبِطٌ
συγκάθεδρος, asses-
sor. |
| vectigal. | | الْفَرَكْلُوسُ مُهْبِطٌ
συντίθεια, stipendum. |
| συνοπτικός, compen-
dium. | | الْفَرَكْلُوسُ مُهْبِطٌ
συνοπτικός, intronizatio. |
| etc. collectivus. | | corrosit. |
| conjunctio. | c., heb. כָּבֵד, ar. شُوֹשָׁ, | caries ; tinea. |
| conjunctionem, con-
junctim. | | coravit ; fo-
vit, allexit, blanditus est ;
forma Sauphel v. inus. |
| cœtus sa-
cer. | | curavit |
| synaxarium, collectio evangeliorum
in missa legendorum. | Ethpa. | curatus est,
fotus est. |
| vox ar. قُسْطَةُ, lex. | | sanatio,
cura. |
| concors. | | equus ; cfr. ar.
exxit, curavit equum ; |
| summa-
rium. | | مُكْلِمٌ |

consumptus est, defecit, periit; اَسْمَأَنْتَ id.; cessavit; cfr. ar. سَافَ periit epizootiā animal. Part. præs. مُسَافِ ، مُسَفِّرًا .
Ethpe. اَسْمَأَنْتَ absemptus est.
Aph. اَسْمَأَنْتَ consumpsit, deficerat, exstirpavit.
 id. q. heb. אַלְמָא, alga marina, inde مُسَافِ وَمُسَافِ mare algosum: mare Rubrum.
 مُسَافِ consummatio, ruina.
 مُسَافِ , مُسَافِ , pl. مُسَافِ , مُسَافِ , مُسَافِ finis, extremitas, limes; مُسَافِ vel مُسَافِ مُسَافِ immensus; adv. مُسَافِ prorsus.
 مُسَافِ ubique.
 et مُسَافِ finitus, fine prædictus.
 مُسَافِ , مُسَافِ consummatio, ruina.
 مُسَافِ finis.
 ut مُسَافِ .
 مُسَافِ consumens, destructor.
 مُسَافِ destructio.
 et مُسَافِ σοφία, sapientia.
 مُسَافِ ad sapientiam pertinens.
 مُسَافِ σοφιστής, sapiens; sophista.
 مُسَافِ sophistice.

الْأَرْسَوْفِيَّةُ sapientia; ars sophistica.

الْأَرْسَوْفِيَّةُ الْأَرْسَوْفِيَّةُ , ars sophistica.

الْأَرْسَوْفِيَّةُ الْأَرْسَوْفِيَّةُ , sophisticus.

Palp. اَرْسَوْفِيَّةٌ v. den., sophis- tice argumentatus est.

الْأَرْسَوْفِيَّةُ ars sophistica.

مَهْفُومًا , id. q. ar. سَفِيفٌ , tex- tum quid e foliis palmæ.

سَمَّى , fut. سَمَّفَ , spiravit, respiravit, exsuxit, absorpsit; odoratus est, c. لِّ rei; cfr. ar. اِنْتَقَ id. Part. act. سَمَّمَا مَسَّ فَبَهْ ; مَهْفَعًا , مَهْفَعًا لَّوْلَى مَهْمَمًا ultimum spiritum jam trahebat.

Ethpe. اَلْهَمَ olfactus est.

Pa. مَهْمَمًا odoratus est; spiravit.

مَهْمَمًا spiritus, respiratio, halitus; olfactus, nares; thumima; cucurbitula (*gall.* ventouse); *trop.* desiderium, ar. شَوْقٌ .

الْأَرْسَوْفِيَّةُ سُوكَّةٌ , ficus arbor et fructus.

مَهْمَمًا respiratio.

مَهْمَمًا respirans, olfaciens.

مَهْمَمًا olfaciens.

الْأَرْسَوْفِيَّةُ olfactus.

مَهْمَمًا respirabilis.

مَهْمَمًا , al. مَهْمَمًا cucurbitula. مَهْمَمًا cucurbitulas applicans, chirurgus.

مَهْمَمًا مَهْمَمًا respirabilis; odorabi- lis.

لَاقِرْتَهْ et مَهْمَمًا سُوكَّةٌ , lacerta.

مَهْمَمًا , v. s. لَاقِرْتَهْ .

مَهْمَمًا , v. لَاقِرْتَهْ .

مَهْمَمًا , pers. سُورِيٌّ , vitriolum rubrum.

سَرِيُّوسٌ مَهْمَمًا Syrus, unde versio Peschito.

سَرِيُّوسٌ مَهْمَمًا syriace. it. سَرِيُّوسٌ id.

سَرِيُّوسٌ مَهْمَمًا v. denom., calluit lingua syriacam.

سَرِيُّوسٌ , v. s. اَلْهَمَ .

سَرِيُّوسٌ et سَرِيُّوسٌ , heb. שָׁמַע et סְרִירָה , fut. סְרִירָה , se lavit, se abluit; trop. purificatus est, baptizatus est; it. natavit; per extens. cucurrit, volavit, se diffudit; irrepsit lepra.

Part. act. et pros. سَرِيُّوسٌ , سَرِيُّوسٌ حَافَّةً . سَرِيُّوسٌ mentha aquatica. Part. pass. سَرِيُّوسٌ , سَرِيُّوسٌ .

Ethpe. اَلْهَمَ lotus est.

Pa. سَرِيُّوسٌ abluit.

Ethpa. اَلْهَمَ pass.

<i>Aph.</i> مَسْتَهْلِكٌ lavit, abluit ; lavare, natare fecit.	مَسْتَهْلِكًا et مَسْتَهْلِكًا venustas, de- cor vultus ; <i>cfr. ar.</i> مَسْتَهْلِكَةٌ co- lor vultus, species.
مَسْتَهْلِكَةٌ natatio ; urinatio ; مَسْتَهْلِكَةٌ piscina. مَسْتَهْلِكًا مَسْتَهْلِكًا se projecit ad natandum.	
مَسْتَهْلِكَةٌ lotio ; natatio.	
مَسْتَهْلِكًا et مَسْتَهْلِكًا , pl. مَسْتَهْلِكَاتٌ lo- tio ; pannus deteriorius.	
مَسْتَهْلِكَةٌ ablutio.	
مَسْتَهْلِكَةٌ , مَسْتَهْلِكَةٌ , pl. f. مَسْتَهْلِكَاتٌ in aqua vivens, natator.	
مَسْتَهْلِكَةٌ rutabulum furni.	
مَسْتَهْلِكَةٌ ablutio ; lavaerum.	
مَسْتَهْلِكَةٌ lavaerum.	
مَسْتَهْلِكٌ — <i>Pa.</i> مَسْتَهْلِك extenuavit.	
مَسْتَهْلِكَةٌ tenuitas ; <i>it. ut</i> مَسْتَهْلِكَةٌ exemplar, codex.	
مَسْتَهْلِكَةٌ tenuis, debili- lis ; pellucidus, subtilis ; pu- tridus, paralyticus.	
مَسْتَهْلِكَةٌ tenuitas, subtilitas ; putredo.	
مَسْتَهْلِكٌ , fut. مَسْتَهْلِكٌ constrin- xit, compressit ; <i>cfr. ar.</i> مَسْتَهْلِكَةٌ id.	
<i>Ethpe.</i> مَسْتَهْلِكٌ pass.	
مَسْتَهْلِكَةٌ compressio.	
مَسْتَهْلِكًا id.	
مَسْتَهْلِكٌ decorus, venustus, <i>cfr.</i> <i>ar.</i> سَخَن polivit.	
مَسْتَهْلِكَةٌ parva locusta.	
مَسْتَهْلِكَةٌ operculum ; eversio.	
مَسْتَهْلِكَةٌ destructio, ruina.	
مَسْتَهْلِكَةٌ eversio, excidium ; dejectio.	
مَسْتَهْلِكَةٌ effusio.	
مَسْتَهْلِكًا , pl. مَسْتَهْلِكَاتٌ ruina.	

مَهْسُوراً evensor.

مَهْسَنَةٌ , cfr. heb. מְסֻנָה circumvit, fut. مَهْسَنَةٌ circumivit mendicando.

Pa. مَهْسَنَةٌ id.; - obfirmavit, forte denomin. a لِمَهْسَنَةٍ vel pro مَهْسَنَةٍ q. v.

مَهْسَنَةٌ et مَهْسَنَةٌ mendicatio.

مَهْسِنُوسٌ mendicus.

الْمَهْسَنَةُ mendicatio.

مَهْسَنَةٌ id.

الْمَهْسَنَةُ et لِمَهْسَنَةٍ , pl. مَهْسَنَاتٍ arx, palatium.

الْمَهْسَنَةُ vas, capsula.

الْمُهْلَك , heb. מַתֵּשׁ , fut. مَهْلَكٌ , se vertit, declinavit, deflexit, recessit.

Aph. مَهْلَكٌ vertit, flexit; declinare fecit, avertit, in errorem induxit, seduxit; it. ut Pe.

Ettaph. مَهْلَكٌ aversus est; declinavit.

الْمُهْلَكَةُ deflexio.

الْمُهْلَكَةُ scalpellum applicantis eucurbitulas.

الْمُهْلَكَةُ declinare faciens, perver sor; apostata.

الْمُهْلَكَةُ deflexio; aberratio, defectio.

الْمُهْلَكَةُ stadium, id. q. مَهْلَكٌ .

الْمُهْلَكَةُ συρατηγόν , commendatitia epistola.

الْمُهْلَكَةُ σεργίους , Virgo constel latione ar. مَهْلَكَةٌ suggestum, cfr. مَهْلَكَةٌ .

الْمُهْلَكَةُ σταβολιας ; حُمَّهْلَكَةٌ stabularius; حُمَّهْلَكَةٌ stabulum.

الْمُهْلَكَةُ στοικέα stoicus.

الْمُهْلَكَةُ παρβολούς parvulus.

الْمُهْلَكَةُ εργάτων , elementa.

الْمُهْلَكَةُ , id. q. مَهْلَكَةٌ .

الْمُهْلَكَةُ στόμαχος , stomachus, cfr. مَهْلَكَةٌ .

الْمُهْلَكَةُ στολή columna, id. q. مَهْلَكَةٌ ; سَانِتُوسْ مَهْلَكَةٌ Sanctus Simeon Styli ta.

الْمُهْلَكَةُ στολή στεμνακή vox liturgica.

الْمُهْلَكَةُ et στολή σταυρός , crux.

الْمُهْلَكَةُ σατύρος , satyrus pl. مَهْلَكَةٌ .

الْمُهْلَكَةُ et لِمَهْلَكَةٌ vox lat., stationes.

الْمُهْلَكَةُ στίγμα , pl. مَهْلَكَةٌ versus.

الْمُهْلَكَةُ στίγμαν , versus.

الْمُهْلَكَةُ et مَهْلَكَةٌ σταύλος columna.

الْمُهْلَكَةُ , heb. مَهْلَكٌ , ar. سَطْرٌ , fut. مَهْلَكٌ , clausit, occlusit. Part. pass. مَهْلَكٌ , مَهْلَكَةٌ ;

gramm. circulo notatum
punctum vocale.

Pa. مُفْرَضٌ constrinxit, impedi-
vit; cohibuit; gramm., de-
nom. a مُفْرَضٌ circulo cor-
rectionis signo litteram nota-
vit.

Ethpa. مُفْرَضٌ pass.

مُفْرَضٌ ligamen, vinculum,
compes.

مُفْرَضٌ στέμμα, corona.

مُفْرَضٌ στόμωψις, ar. شطام chal-
lybs; cfr. مُفْرَضٌ.

مُفْرَضٌ, pl. مُفْرَضَاتٌ id. q. seq.
مُفْرَضٌ utriculus.

مُفْرَضٌ اِمْتَهَنٌ στάμνος, vas vi-
narium.

مُفْرَضٌ, heb. צָבֵחַ, ar. شَيْطَانٌ, ad-
versarius, oppugnans; Sata-
nas.

مُفْرَضٌ satanicus.

مُفْرَضٌ et مُفْرَضٌ στάσις,
sedatio.

مُفْرَضٌ seditious.

مُفْرَضٌ, fut. مُفْرَضٌ ut usi-
tatus *Pa.*

Pa. مُفْرَضٌ seidit, incidit; it.
pactus est; cfr. ar. مُفْرَضٌ scari-
ficavit.

Ethpa. مُفْرَضٌ pass.

مُفْرَضٌ scarificatio, incisio.

مُفْرَضٌ scissio, scalpellum.

مُفْرَضٌ et مُفْرَضٌ, id. q.
مُفْرَضٌ stacte.

مُفْرَضٌ pro مُفْرَضٌ scripsit, ar. سطر.
مُفْرَضٌ, مُفْرَضٌ, ar. شطر pars,
latus; alias quam, præter,
sine, c. vel s. مُفْرَضٌ; c. مُفْرَضٌ
prope; مُفْرَضٌ scorsum a,
excepto. مُفْرَضٌ præter,
præterquam; c. مُفْرَضٌ, مُفْرَضٌ
seorsim; مُفْرَضٌ id.; obli-
que; c. مُفْرَضٌ, مُفْرَضٌ مُفْرَضٌ absque,
sine, præter; contra. مُفْرَضٌ
بَلْ præterquam quod, nisi.
مُفْرَضٌ et cætera.

Pa. مُفْرَضٌ v. denom., ar. شطر,
in duas partes secuit; declin-
avit, fugit.

Ethpa. مُفْرَضٌ sibi partes sum-
psit, sibi arrogavit, c. مُفْرَضٌ rei.

Aph. مُفْرَضٌ attribuit. Part.
pass. مُفْرَضٌ attributus;
falso attributus.

مُفْرَضٌ, ar. ساطور, magnus
culter coqui.

مُفْرَضٌ lateralis.

مُفْرَضٌ στρατηγέτης,
dux militum.

مُفْرَضٌ f., στρατός, exercitus.
مُفْرَضٌ στρόβιλος, strobi-
lus, nux pini.

مُفْرَضٌ στρύχη, strychnum,
solanum herba.

حصہ	στρανθίον, struthium, herba lanaria.	حصہ	σελιδίον, tabula chronologica.
حصہ	στρατηγός, pl.	حصہ	solium.
حصہ	dux militum.	حصہ	σελήνη, luna.
حصہ	στρατός, miles.	حصہ	, pl. στράτεον, signum.
حصہ	στρατηλάτης, id.	حصہ	, v. s. .
حصہ	στρηγία, libido; luxuries; cfr. حصہ.	حصہ	luna; apud alchimistas argentum.
حصہ	στράπα, præfector.	حصہ	cos lapis.
حصہ	pl. اُلْمَوْهَدَةٌ præfec-tura.	حصہ	στρύμβιον, mentha.
حصہ	pl. حصہ, vox latina, sigillum, diploma.	حصہ	ramus virens.
حصہ	et اُلْمَوْهَدَةٌ, v. s. .	حصہ	pl. اُلْمَوْهَدَةٌ, it. اُلْمَوْهَدَةٌ pl. اُلْمَوْهَدَةٌ turma, cœtus.
حصہ	heb. شَدَّ, ar. شید, calx, gypsum.	حصہ	, v. s. .
حصہ	confector, venditor gypi.	حصہ	سَيْفٌ, gladius.
حصہ	στόλιον, cortex mali punici.	حصہ	acus pini, folia acubus similia.
حصہ	, v. s. .	حصہ	اَنْجِيلُ, ar. اَنْجِيلُ, carnifex, gladiator.
حصہ	vide فَوْهَ.	حصہ	dim., gladiolus.
حصہ	σίτλα, situla.	حصہ	σέρων, fluctus agitati, tempestas.
حصہ	σιτικόν, horreum.	حصہ	σίκυος, cucumis.
حصہ	canalis; it. corbis, v. حَلَّ.	حصہ	، v. s. .
حصہ	dim., canalis; tubulus.	حصہ	σίκλος, siclus moneta.
حصہ	silurus piscis.	حصہ	sectio, capitulum.
حصہ	pl. حَلَّاتٍ, σέλλα, latrina.	حصہ	σειρά, pl. حَصَّاتٍ, حَصَّاتٍ, cfr. ar. سَيْرَةٍ, filum, funiculus, catena; textum
حصہ	σιλίγνιον, species placenti.		

quid, *inde lorica*; *it.* pulvis; *nnq. ut seq.*

مَهْمَنْهَهْ مَهْمَنْهَهْ et مَهْمَنْهَهْ pl.

سَيِّرَنْ , c., syren, lamia.

مَهْمَنْهَهْ مَهْمَنْهَهْ σηρικόν , minium.

مَهْمَنْهَهْ vox ar. سَيِّدَةَ contr. a سَيِّدَةَ domina.

مَهْمَنْهَهْ , v. s. مَهْمَنْهَهْ .

مَهْمَنْهَهْ, *inus.* — *Pa.* مَهْمَنْهَهْ exspectavit. مَهْمَنْهَهْ pro مَهْمَنْهَهْ exspectamus.

Ethpa. مَهْمَنْهَهْ pass.

مَهْمَنْهَهْ , مَهْمَنْهَهْ exspectatio.

كَهْ آمَرْ وَلَمْ مَهْمَنْهَهْ inexppectato.

مَهْمَنْهَهْ مَهْمَنْهَهْ مَهْمَنْهَهْ non secundum exspectationem seu vota eorum.

مَهْمَنْهَهْ , v. s. مَهْمَنْهَهْ .

مَهْمَنْهَهْ exspectativus.

مَهْمَنْهَهْ exspectatus.

مَهْمَنْهَهْ exspectato.

مَهْمَنْهَهْ barba tenuis sed prolixa.

مَهْمَنْهَهْ trapezita, nummularius.

مَهْمَنْهَهْ مَهْمَنْهَهْ σχολή , schola; pl. مَهْمَنْهَهْ cf. ar. أَمْكَنْهَهْ ; f. culter, pl. مَهْمَنْهَهْ et مَهْمَنْهَهْ .

مَهْمَنْهَهْ , f. مَهْمَنْهَهْ , pl. مَهْمَنْهَهْ scholaris; *in f.* genus hymni.

مَهْمَنْهَهْ et مَهْمَنْهَهْ , pl.

مَهْمَنْهَهْ σχόλιον , scholion, brevis explicatio.

مَهْمَنْهَهْ كَهْ كَهْ كَهْ it. pl.

مَهْمَنْهَهْ كَهْ كَهْ كَهْ συγλαστικός, scholasticus; rector scholæ.

مَهْمَنْهَهْ كَهْ كَهْ كَهْ σγοῖνος , juncus.

مَهْمَنْهَهْ كَهْ كَهْ كَهْ σγεδία , navicula.

مَهْمَنْهَهْ كَهْ كَهْ كَهْ كَهْ كَهْ كَهْ σγεδάρια , tabellæ scriptoris.

مَهْمَنْهَهْ , v. s. مَهْمَنْهَهْ .

مَهْمَنْهَهْ et مَهْمَنْهَهْ σγίνος , pistacia, lentiscus *arbor.*

✓

مَهْمَنْهَهْ, *inus.*; *cfr. ar.* شَكْ confixit.

Pa. مَهْمَنْهَهْ confixit.

Ethpa. مَهْمَنْهَهْ pass.

مَهْمَنْهَهْ , ar. شَكْ , arsenicum.

مَهْمَنْهَهْ , ar. شَكْ , pl. سَكَنَةَ Paxillus, clavus, vomer aratri; cuneus, forma, matrix monetæ obsignandæ; *in pl.* furunculus, verruca.

مَهْمَنْهَهْ , ar. سَخَانَ , gubernaculum navis.

مَهْمَنْهَهْ gubernaculo similis.

مَهْمَنْهَهْ , heb. شَبَرִيָ , cfr. ar. سَكِينَ , f. culter, pl. مَهْمَنْهَهْ مَهْمَنْهَهْ et مَهْمَنْهَهْ .

مَهْمَنْهَهْ dentale, vomer aratri.

مَهْمَنْهَهْ velum calicis a rad.

سَكَنَةَ , texit.

مَهْمَنْهَهْ دَهْ دَهْ fixe, firmiter.

✓

مَهْمَنْهَهْ, *fut.* نَهْ نَهْ stul-

us fuit, stulte se gessit ; cfr. heb. סָלֵל, id.

Ethpe. حَفَّاً cognitus est, intellectus est, *nng.* intellexit, *pro rectiori Ethpa.*

Pa. حَفَّاً , شَدَّلَ , erudivit, docuit, *c. acc. vel* حَفَّاً pers. et *acc. rei*, declaravit ; *it.* stultitia affecit *Deus.*

Ethpa. حَكَّاً intellectus est, cognovit ; prudentem, docilem se præbuit ; consideravit.

c. d.

Aph. حَفَّاً ut *Pe.*; *it.* inique egit, erravit, deliquit, peccavit.

Ettaph. حَفَّاً لِّا patratum est peccatum.

حَلَّا stultitia.

حَلَّا , مَحَلًا , f. emph. حَلَّا stultus. بِهِ مَدْ حَفَّاً quam insulsus est suus liber.

حَلَّا stulte.

حَلَّا , مَحَلًا , pl. حَلَّاتٍ , stultitia error ; delictum, peccatum. بِهِ مَحَلًا , sine delicto : innocentia.

حَلَّا intellectus, prudentia, eruditio ; cogitatio, sententia ; sensus, explicatio brevis, nota. أَبْ حَلَّا secundum sententiam.

حَلَّا ad sensum pertinens,

opponitur حَنْيَا مُكْتَمِا litteralis ; abstractum nomen.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ prudens, sapiens, sagax.

حَمَدَهَ حَمَدَهَ نَمَهَ prudenter, sapienter.

حَمَدَهَ حَمَدَهَ نَعَمْ intelligentia, prudentia ; يَعَمْ حَمَدَهَ حَمَدَهَ sapientia vestra, *titulus dignitatis datus Episcopis.*

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ intelligentia et حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ sapientia vestra, *titulus dignitatis datus Episcopis.*

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ stultitia ; delictum.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ erudiens, doctor.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ delinquens, prævaricator.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ intelligibilis, mysticus ; is contra quem delinquitur.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ mystice.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ actio intelligendi, intellectio.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ et derivata v. s. حَمَدَهَ .

حَفَّا inus. ; cfr. ar. سَكَنْ quievit, cessavit a labore, pauper fuit.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ , et saepius حَمَدَهَ , f. emph. حَمَدَهَ حَمَدَهَ , pl. f.

حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ حَمَدَهَ , ar. منكين , pauper, egenus ; infirmus, tenuis, vilis.

Pa. مَحْفَفٌ *v. denom.*, pauperem efficit Deus, ad paupertatem redegit; *seq.* مَحْفَفٌ paupertatem simulavit.

Ethpa. مَحْفَفٌ pauper factus est; debilitatus est, diminutus est; privatus est, *seq.* مَحْفَفٌ مُّهْمَدٌ misere, tenuiter.

مَحْفَفَةٌ paupertas, miseria; tenuitas.

مَحْفَفَةٌ paupertati obnixius.

مَحْفَفٌ et مَحْفَفٌ, *v. s.* مَحْفَفٌ.

مَحْفَفٌ qui ad egestatem de trudi potest; مَحْفَفٌ inexhaustae divitiae.

مَحْفَفَةٌ redactio ad paupertatem.

مَحْفَفَةٌ et مَحْفَفَةٌ prolix erines in fronte.

مَحْفَفٌ, pers. - ar. سَكَنْجِين, مَحْفَفٌ, oxymel.

مَحْفَفٌ, *heb.* כָּבֵר, *ar.* ar., fut. مَحْفَفٌ, clausit, occlusit, obstruxit; cohibuit, *cfr.* مَحْفَفٌ.

Ethpe. مَحْفَفٌ pass.

Pa. مَحْفَفٌ obturavit; trop. struxit occulte *insidias*. *Part. pass.* مَحْفَفٌ, مَحْفَفٌ; *it. denom.*, clypeo munitus.

Ethpa. مَحْفَفٌ pass.

مَحْفَفٌ sera, claustrum.

مَحْفَفٌ oeclusio, obstructio, ag ger, obstaculum.

مَحْفَفَةٌ oeclusio.

مَحْفَفٌ f. elypeus, scutum.

مَحْفَفٌ obstrictio.

مَحْفَفٌ et مَحْفَفٌ agger.

مَحْلًا, fut. مَحْلًا rejectit, contempsit. Part. act. مَحْلًا, مَحْلًا. Part. pass. مَحْلًا, مَحْلًا.

Ethpe. مَحْلًا pass.

Pa. مَحْلًا ut usitat. *Aph.*

Aph. مَحْلًا rejectit, abjecit, reprobavit. Part. act. مَحْلًا, مَحْلًا. Part. pass. مَحْلًا, مَحْلًا, f. emph. مَحْلًا, abominandus, profanus.

Ettaph. مَحْلًا pass.

مَحْلًا et مَحْلًا, مَحْلًا rejectio, abominatio; rejectaneum quid, purgamentum; scoria. مَحْلًا spurius.

مَحْلًا purgamentum; latrina.

مَحْلًا, ar. شَلَيْيَة purgamen tum.

مَحْلًا, ar. سُلَلًا, spina.

مَحْلًا f., *heb.* שְׁלִשָּׁה, ar. سُلَى coturnix.

مَحْلًا rejectio.

مَحْلًا rejectio; vilitas.

مَحْلًا contemptor.

مَهْمَتْنَا	cum contemptu.	مَهْمَتْنَا	nummus sultani nomine procusus.
مَهْمَتْنَا	rejectio, contemptus.	مَكْسُّا	nubes densa, caligo.
مَهْمَتْنَا	<i>id.</i>	مَكْنَتْنَا	مَكْنَتْنَا <i>id.</i>
مَهْمَتْنَا	rejectio, abominatio.	مَهْلَلا	<i>et</i> مَهْلَلا <i>c.</i> , emph. مَهْلَلا , pl. مَهْلَلا , مَهْلَلا ; it. مَهْلَلا , pl. مَهْلَلا , heb. כְּלָלָה , ar. سَلَلَةٌ , corbis, canistrum.
مَهْلَلا	<i>al.</i> مَهْلَلا , alga.	مَلَامِدْبُوا	مَلَامِدْبُوا et مَلَامِدْبُوا , مَكْمَدْبُوا
مَهْلَلا	<i>f.</i> , σέλαχος , piscis cartilaginosus.	سَالَامَانْدَرَا	σαλαχύνδρα , salamandra.
مَهْمَدْ	egenus, debilis, vilis ; cfr. ar. مَهْمَدْ exspoliavit.	مَكْنَتْيَا	مَكْنَتْيَا vox lat., silentarius, nomen dignitatis.
مَهْمَدْ	σιλίγνιον , siligo, tritum aestivum.	مَهْلَسْتِ	مَهْلَسْتِ pl. siclus moneta.
مَهْلَسْتِ	composuit, v. s.	مَهْلَفَا	مَهْلَفَا , ar. سَافِ levir, f. مَهْلَفَا uxor leviri.
مَهْلَسْتِ	مَهْلَسْتِ et مَهْلَسْتِ ; it. مَهْلَسْتِ	مَهْلَفِيَا	مَهْلَفِيَا fornix.
مَهْلَسْتِ	σελίδιον , pagella, columna libri.	مَهْلَفِيَا	مَهْلَفِيَا σιλφίον , silphium.
مَهْلَمْ	et مَهْلَمْ , v. s. مَهْلَمْ .	مَهْلَصْ	مَهْلَصْ , fut. مَهْلَصْ , imper.
مَهْلَمْ	مَهْلَمْ mustela.	مَهْلَصْ	مَهْلَصْ , infin. مَهْلَصْ , c. excidio
مَهْلَمْ	σελλίον , neolog., scabellum, v. مَهْلَمْ .	مَهْلَصْ	مَهْلَصْ , ascendit ; nave consceddit ; e navi ad portum appulit ; abiit, migravit, profectus est contra hostes, c.
مَهْلَمْ	ار. سَلْحَقَةٌ , testudo.	مَهْلَصْ	مَهْلَصْ , invasit, impetivit, sursum latus est, evecta est res ; oblata est hostia ; processit, crevit ; crevit numerus, summa confeicit ; exiit res, contigit, bene successit, superavit, seq. مَهْلَصْ ; c. لَهْلَصْ relatus est ad. مَهْلَصْ دَهْلَصْ processit secundum typum : simillimus
مَهْلَهَا	σελευκίς , turdus seleucis (ar. سَعْزَمَرْ).		
مَهْلَهَا	et مَهْلَهَا σίλουρος , silurus piscis , cfr. ar. سَلْزَرْ et صَلْزَرْ .		
مَهْلَهَا	silex lapis ; ensis ; cfr. ar. صَاتْ magnus culter, et gladius.		
مَهْلَهَا	ar. سُلْطَانٌ , sultanus, rex.		

fuit. مُسْتَعْدِيْلَةً لَا مُكْتَبَةً كَثِيرًا propositum ejus non bene successit مُكْتَبَةً حَذَقَ مُكْتَبَهُ quinquies duo ascendunt i. e. sunt deceim. مُكْتَبَاتٍ مُكْتَبَهُ abeatibus in pace. Part. act. مُكْتَبَهُ مُكْتَبَهُ . Part. pass. مُكْتَبَهُ مُكْتَبَهُ elevatus ; oblatus. مُكْتَبَهُ فَرِيقٌ proficiens est corpori cibis. مُكْتَبَهُ مُكْتَبَهُ vel مُكْتَبَهُ مُكْتَبَهُ in mentem ejus venit ; ejus mentem movit. مُكْتَبَهُ دَفَعَ مُكْتَبَهُ prodiens secundum omnes colores : colores omnes referens lana.

Pa. مُكْتَبَهُ ascendere fecit, extulit.

Ethpa. مُكْتَبَهُ elevatus est, se sustulit.

Aph. مُكْتَبَهُ ascendere fecit, evexit ; obtulit sacrificium ; edificium erexit ; tributum solvit ; suscitavit, sustulit, eduxit, extulit ; adduxit ; superaddidit, adjecit, attribuit ; rejecit ; destillavit. مُكْتَبَهُ مُكْتَبَهُ delectum hominum instituit, milites conscripsit. مُكْتَبَهُ victorice coronam obtinuit. مُكْتَبَهُ مُكْتَبَهُ radicitus evulsit. مُكْتَبَهُ مُكْتَبَهُ ei suggestit ; in mentem suam re-

vocavit. Part. act. مُكْتَبَهُ مُكْتَبَهُ مُكْتَبَهُ tributa solventes. Part. pass. مُكْتَبَهُ مُكْتَبَهُ elevatus ; obductus ; مُكْتَبَهُ مُكْتَبَهُ aqua destillata. subst. v. infra.

Ettaph. مُكْتَبَهُ مُكْتَبَهُ , et minus recte مُكْتَبَهُ مُكْتَبَهُ , evectus est, elevatus est ; مُكْتَبَهُ مُكْتَبَهُ ascensu difficilis.

مُكْتَبَهُ ascensio ; sublimatio ; gramm. punctum litteræ (o) superimpositum.

مُكْتَبَهُ ascensio ; ventilatio. مُكْتَبَهُ مُكْتَبَهُ et مُكْتَبَهُ ascensio ; plantago (gall. plantain).

مُكْتَبَهُ ascensio, festum Ascensionis Christi, unde ar. سُلَاقٌ ; ascensus, progressus.

مُكْتَبَهُ مُكْتَبَهُ excusatio, defensio. مُكْتَبَهُ ventilatio granorum. مُكْتَبَهُ ascendere faciens, elevans.

مُكْتَبَهُ f. præc. ; it. subst. tubulus textorius.

مُكْتَبَهُ مُكْتَبَهُ , ascensio ; assumptio, oblatio ; expeditio militaris ; et مُكْتَبَهُ مُكْتَبَهُ مُكْتَبَهُ ortus solis ; tempore ortus solis. مُكْتَبَهُ مُكْتَبَهُ transcriptio in folia membran-

- nea; it. *ap. alchim.* excoctum
metallum (*gall.* sublimé).
اَسْكَنْدَرْيَا, pl. اَسْكَنْدَرْيَة ascensus ;
 declivitas, clivus : gradus,
 scala ; elatio, translatio, im-
 portatio *tritici* ; regressus,
 reditus : expeditio bellica ;
اَسْكَنْدَرْيَا وْ مُنْتَهِيَة e mortuis
 resurrectio.
اَسْكَنْدَرْيَا, pl. اَسْكَنْدَرْيَة elevans ;
 subst. ascensus, gradus ; re-
 bellio. اَسْكَنْدَرْيَا وْ قَرْنَاء sub au-
 roram.
اَسْكَنْدَرْيَا elevatio, contemplatio.
اَسْكَنْدَرْيَا ad ascensum pertinens.
اَسْكَنْدَرْيَا exemplar ; narratio.

اَسْكَنْدَرْيَا et اَسْكَنْدَرْيَا, fut. اَسْكَنْدَرْيَا^ا
 cæcus fuit, cæcus factus est.
 Part. præs. اَسْكَنْدَرْيَا cæcus.
 Part. præt. et adject. اَسْكَنْدَرْيَا , f. emph. اَسْكَنْدَرْيَا , pl.
اَسْكَنْدَرْيَا, emph. اَسْكَنْدَرْيَا , f.
اَسْكَنْدَرْيَا cæcus. اَسْكَنْدَرْيَا
 mente obcæcati. اَسْكَنْدَرْيَا مُهُومَة membra obtecta : pudenda.
 Pa. اَسْكَنْدَرْيَا exæcavit, cæcum
 reddidit. Part. pass. اَسْكَنْدَرْيَا .
Ethpa. اَسْكَنْدَرْيَا cæcus factus est.
Aph. اَسْكَنْدَرْيَا claudicavit.
اَسْكَنْدَرْيَا claudicatio.
اَسْكَنْدَرْيَا et اَسْكَنْدَرْيَا cæcitas.
اَسْكَنْدَرْيَا et اَسْكَنْدَرْيَا claudicatio.

اَسْكَنْدَرْيَا مُهُومَة obcæcans.
اَسْكَنْدَرْيَا stibium.
اَسْكَنْدَرْيَا, v. اَسْكَنْدَرْيَا .
اَسْكَنْدَرْيَا similago contusa.
اَسْكَنْدَرْيَا, ar. سَوِيدَة simila ; adj.
 e similagine confectus.

اَسْكَنْدَرْيَا, heb. פָּלָג, flos vitis
 (gr. φύλαγχος).
Pa. اَسْكَنْدَرْيَا v. denom.. floruit.
Part. اَسْكَنْدَرْيَا florens ; f. et
 subst. اَسْكَنْدَرْيَا flos vitis.
اَسْكَنْدَرْيَا مُهُومَة germinatio vitis.
اَسْكَنْدَرْيَا مُهُومَة smyrna, myrra.
اَسْكَنْدَرْيَا ductor cæcorum.
اَسْكَنْدَرْيَا vulpes : utriculus.
اَسْكَنْدَرْيَا et اَسْكَنْدَرْيَا radix betæ.
اَسْكَنْدَرْيَا σημεῖον, signum morbi.
اَسْكَنْدَرْيَا συκῆ, smilax arbor.
اَسْكَنْدَرْيَا συκίνιον, semi-
 cinetium. cineticulus (*gall.*
 tablier).

اَسْكَنْدَرْيَا, heb. פָּלָג, fut. اَسْكَنْدَرْيَا^ا,
 fulcivit, sustinuit ; intr. inni-
 xus est, inclinavit, incubuit,
 c. اَسْكَنْدَرْيَا ; appulit navis ; advenit ;
 descendit, c. اَسْكَنْدَرْيَا loci ; seq. اَسْكَنْدَرْيَا
 declinavit ; trop. pressit hos-
 tis, calamitas, c. اَسْكَنْدَرْيَا .
اَسْكَنْدَرْيَا لَحْيَة se sustentavit cibo.

Part. act. مُفْعَلٌ ; *emph. et subst.* مُفْعَلَةً fulerum, columna ; *gramm. nomen puncti.* *Part. pass.* مُفْعَلَةً , مُفْعَلَةً fultus ; *adj.* stabilis ; *accumbens.* نَقْعَدًا وَلَا مُفْعَلَةً animæ instabiles.

Ethpe. يَنْخِعُ innixus est,
recubuit, c. يَنْخِعُ; confidit, c. يَنْخِعُ
vel يَنْجِعُ.

Pa. **فَعَلَّ** fulcivit; sustentavit,
firmavit, roboravit, adjuvit;
it. accumbere fecit.

Ethpa. የዕለታዊ pass. et refl.

Aph. حَمْلَةً accumbere fecit ;
fulcivit, roboravit.

مَعْدِلٌ, **مَعْدِلٌ** accubitus, inde
convivium; cœtus conviva-
rum; **مَعْدِلٌ** **مَعْدِلٌ** per
contubernia; it. pulvinar;
nng: pro **مَعْدِلٌ** fulcrum.

مُعْنَد adjunctio; gramm.,
nominis adnexio (ar. اسناد).

Lo*m* qui sustinet, adju-
tor.

فُلْكَرُمْ، مَعْلُوْمْ fulcrum,
columen; pilentum *camelis superimpositum*; sustentatio;
gramm. adnexio, *id. q. ar.*
اسناد.

مُحَدِّثٌ, pl. مُحَدِّثُونَ accumbens; conviva.

مَكْعَبٌ, مَكْعَبًا cubile. **كُلُّ**

فُلْكِمَنْتُ fulcimentum: **فُلْبِنْرٌ** pulvinar.

مَهْمَدْهَنْ sustentans, adjutor.
مَهْمَدْهَنْ nomen litteræ **هـ**.

מְמֻלָּה f., heb. טַבֵּל , ar. شَمَال , latus sinistrum, sinistra manus, c. vel s. اَبْعَدْ ; trop. maliitia ; homines mali. مُهَمَّلٌ و مُهَمَّلٌ vox i. e. verba Christi ad reprobos. لَتْرَه مُهَمَّلٌ latro qui ad sinistram Christi pendebat. دَنْتَه مُهَمَّلٌ filii sinistriæ: reprobi. و مُهَمَّلٌ و مُهَمَّلٌ id.

مَعْدِلٌ a sinistra parte.
مَعْدِلٌ, f. **مَعْدِلٌ** sinister, laevus ; *trop.* malus,
مَعْدِلٌ pravus, infelix.
مَعْدِلٌ ambidexter.

فَرْمَه, مَهْمَهْ, pl. مَهْمَهْتَنْتَ phar-
macum; herba medicinalis,
heb. فَرْمَه aroma; abs. vel seq.
أَرْمَهْ, venenum, ar. مَهْمَهْ; it.
pigmenta, color. **فَرْمَهْ مَهْمَهْ** me-
dicina serpentis; gentiana
planta. **فَرْمَهْ مَهْمَهْ** medicamen-
tum vitæ: Christus. **فَرْمَهْ مَهْمَهْ**
pharmacum mortis: vene-
num. **فَرْمَهْ مَهْمَهْ** medicina gla-
dii: sanguis draconis herba.
فَرْمَهْ مَهْمَهْ et قُوَّةٌ vel قُوَّةٌ
هَمْهَهْ وَمَهْمَهْ id.

Pa. مَهْمَّهُ verb. denom., occidit veneno ; ar. سَمَّرْ .

Ethpa. مَهْمَّهُ pass.

Palp. مَهْمَّهُ pharmacum dedit ; curavit, sanavit.

Ethpalp. مَهْمَّهُ pharmaco usus est ; curatus est.

Aph. مَهْمَّهُ ut مَهْمَّهُ .

مَهْمَّهُ veneno infectus.

مَهْمَّهُ σφῆμα , fuligo lucernæ.

مَهْمَّهُ venenatio.

مَهْمَّهُ , مَهْمَّهُ curatio, sanatio.

مَهْمَّهُ sordidus.

مَهْمَّهُ lacerta venenosa ; ar. سَافَرْ أَبْرَصْ .

مَهْمَّهُ , مَهْمَّهُ venenatus.

مَهْمَّهُ vulpes, ut مَهْمَّهُ .

مَهْمَّهُ , ar. يَسْتَارْ , proxeneta.

مَهْمَّهُ mentha.

مَهْمَّهُ contrastavit; emaciavit austeritate vitæ ascetice ; cfr. ar. إِشْمَالْ et إِسْمَاعِيلْ . emaciatus est. Part. pass.

مَهْمَّهُ , مَهْمَّهُ debilitatus, deformatus ; austerus, asceticus ; anachoretico vestitu insignitus.

Ethpa. مَهْمَّهُ pass.; ascetice vixit.

مَهْمَّهُ tristitia ; vita ascetica, austertas, continentia.

مَهْمَّهُ مَهْمَّهُ مَهْمَّهُ vestitus anachoreta rum.

مَهْمَّهُ مَهْمَّهُ ascetice.

مَهْمَّهُ مَهْمَّهُ مَهْمَّهُ ascetica vita ; continentia.

مَهْمَّهُ مَهْمَّهُ مَهْمَّهُ et مَهْمَّهُ مَهْمَّهُ مَهْمَّهُ سَبُلُونْ , marjorana, amaracus planta (gall. marjolaine).

مَهْمَّهُ مَهْمَّهُ et مَهْمَّهُ fut. مَهْمَّهُ ruber fuit, rubuit.

Pa. مَهْمَّهُ rubrum fecit.

Ethpa. مَهْمَّهُ ut *Pe.*; it. erubuit.

مَهْمَّهُ مَهْمَّهُ f. مَهْمَّهُ ruber ; rubro, minio coloratus ; in. f. absol. vel e. مَهْمَّهُ flava bilis ; subst. rubrum, minium ; littera minio illustrata ; fucus ; vitellus ovi ; rhus arbucula, ar. سَقَانْ ; carbunculus lapis.

مَهْمَّهُ مَهْمَّهُ dim. præc., rubidus.

مَهْمَّهُ rubedo ; rubor.

مَهْمَّهُ rubro colorans.

مَهْمَّهُ مَهْمَّهُ fucus mulierum.

مَهْمَّهُ مَهْمَّهُ targum. رَكْبَرْ , rufus, ar. شَقَرْ .

Estaphali مَهْمَّهُ v. denom., rufus factus est.

مَعْدُونٌ مَعْدُونٌ rubedo.

مَعْدُونٌ et مَعْدُونٌ it. مَعْدُونٌ et
سَوْرٌ, ar. villosæ pel-
lis animal (*gall. martre*).

أَسْمَرٌ, ar. fuscus.

مَعْدُونٌ, id. q. مَعْدُونٌ et
إِبْرَاءٌ σμάραγδος, ar.
زُمرُدٌ smaragdus gemma.

مَعْدُونٌ, heb. شَنَّا, ar.
fut. مَعْدُونٌ, odio habuit, con-
tempsit; noluit. Part. act.
مَعْدُونٌ, pl. مَعْدُونٌ, mnq.
مَعْدُونٌ, st. c. m. مَعْدُونٌ; subst.
c. l. guttur. seu hamza arab.
servato مَعْدُونٌ, ar. شَنَّا,
pl. مَعْدُونٌ, st. c. مَعْدُونٌ et
مَعْدُونٌ, f. مَعْدُونٌ osor, inim-
icus; c. aff. مَعْدُونٌ, مَعْدُونٌ,
مَعْدُونٌ inimicus meus,
tuus, vester, suus; pl. مَعْدُونٌ
inimici mei, etc. Part. pass.
مَعْدُونٌ odio habitus,
exosus, odiosus; horrendus,
turpis, f. emph. مَعْدُونٌ, pl. m.
مَعْدُونٌ, emph. مَعْدُونٌ, f.
f. emph. et subst. مَعْدُونٌ exosa
sclera; formam particip. ad-
ject. مَعْدُونٌ v. infra.

Ethpe. مَعْدُونٌ odio habitus est;
turpis factus est; macilentus
evasit, contabuit.

Ethpa. مَعْدُونٌ id.

Aph. مَعْدُونٌ deturpavit, defor-
mativ; odiosum effecit.
Ethpan. مَعْدُونٌ odium exci-
tavit.

مَعْدُونٌ مَعْدُونٌ et مَعْدُونٌ f.
formam partic., hebr. שָׁנָא,
odiosus.

مَعْدُونٌ, f. emph. مَعْدُونٌ, pl.
مَعْدُونٌ, pl. مَعْدُونٌ, exosus, odio
habitus, odio dignus.

مَعْدُونٌ, ar. شَنَّة, st. cst. مَعْدُونٌ,
pl. مَعْدُونٌ odium, inimicitia.
مَعْدُونٌ et مَعْدُونٌ odium.

مَعْدُونٌ prave.

مَعْدُونٌ et مَعْدُونٌ odium; hor-
ror, turpitude, foeditas.
مَعْدُونٌ, pl. مَعْدُونٌ osor, inimi-
cus.

مَعْدُونٌ odio habitus.

مَعْدُونٌ odium.

مَعْدُونٌ, heb. כְּנַה, rubus.

مَعْدُونٌ وَكَحْلًا rosa canina.

مَعْدُونٌ rubus, tribulus.

مَعْدُونٌ, مَعْدُونٌ, f., مَعْدُونٌ,
συνήγορος, advo-
catus, defensor, adjutor.

مَعْدُونٌ συνηγόρια, advoca-
tio, defensio, apologia.

مَعْدُونٌ advocatio.

Ethpa. مَعْدُونٌ v. denom.,
patrocinatus est, adjuvit.

حَنْدَةٌ , ar. سُبَّلٌ , spica, opobalsamum.

حَنْدٌ voluptas, titillatio voluptatis.

حَنْدَقَةٌ , pers.-ar. زَنْجِفَرٌ , cinnabaris.

حَنْدَمَةٌ planta palustris.

حَنْدِيَانٌ , pers.-ar. سِنْدِيَانٌ , quercus.

حَنْدُوقٌ , ar. صَنْدُوقٌ , cista, theca.

حَنْدُوكٌ et حَنْدُوكٌ مَهْمَهْ مَهْمَهْ σάνδυξ , sandyx, cinnabaris, minium.

حَنْدُوكٌ σάνδαλον , sandalium.

حَنْدُوكٌ nomen accentus.

حَنْدُوكٌ sandaliarius.

حَنْدُوكٌ sandalum, ar. صَنْدَلٌ (gall. bois de sand).

حَابَبَوْقَى , حَبَبَوْقَى , حَبَبَوْقَى et حَبَبَوْقَى σανδαράκη , pers. سَنْدَرَوْسٌ , sandaraca.

حَبَبَوْقَى συνέδριον , synedrion, coetus.

حَبَبَوْقَى et deriv., v. حَبَبَوْقَى .

حَلْ - Pa. حَنْتٌ , ar. سَطَ , imberbus fuit.

حَلْ imberbus ; it. cribrum.

حَلْ imberbus ; it. gluten quo apes aperturas alvearis occludunt, propolis ; ipsum alveare.

حَلْ vox lat., senator.

حَلْ et حَلْ gibbus cameli.

حَلْ smegma, mixtura.

حَلْ σύγχοιας , conventus ad sacra.

حَلْ , fut. حَلْ , imp. حَلْ , ar. شَنَّ , cibravit, percolavit ; purificavit. Part. pass. حَلْ , حَلْ cibratus ; purgatus.

Aph. حَلَّ , ar. أَشَنَّ , infudit quasi per colum.

حَلْ , pl. حَلْ , ar. شُنُونٌ , حَلْ hirundo ; vesperilio. حَلْ حَلْ costae minores.

حَلْ , emph. حَلْ , pl. حَلْ et حَلْ canistrum, corbis, cfr. حَلْ collegit.

حَلْ , fut. حَلْ introduxit. Pa. حَنْتٌ accinxit vestes, inde diligens fuit ; cfr. ar. constrinxit jumentum et diligenter fecit rem.

حَلْ introductio, translatio. حَلْ præcinctio vestium ; trop. diligentia.

حَلْ , id. q. حَلْ , vide s. حَلْ .

حَلْ indiguit, pler. usurp. adj. in partic. preter. حَلْ , pauper ; indigens, necesse ha-

bens, c. ﴿, ﻦـ, speciat. ﴿,
 vel, c. fut.; ﺍـهـدـهـمـ، وـهـدـهـمـ necessere habemus scribere;
 cfr. ar. ﺪـهـنـ rei amore captus
 fuit.

Ethpe. اَهْدِيْهُ indiguit; opus
habuit, c. اَهْدِيْهُ; بَهْرَمَهُ اَهْدِيْهُ
eum arcessivit invite; im-
pers. اَهْدِيْهُ indigi.

Ethpa. هَذِهِ لَيْلَةٌ مُّصْبَرٌ.

Aph. اهْنَىٰ indigere fecit,
ad miseriam redegit; coegit.
اهْنَىٰ، مَهْنَىٰ indigentia,
necessitas; res necessariæ.
كُسْدَا، مَهْنَىٰ panis quo indi-
gemus. لَاهْنَىٰ suppe-
ditatio rerum necessariarum.
لِيَاهْنَىٰ necessarius.

|La^سم^نح^ما et |La^سم^نح^ما indigentia ;
necessitas.

ئەپا — Pa. ھەن movit caput.
Ethpa. ھەنکەن galea induitus
est, denom. a seq.

الستور galea ; *cfr. ar.* مهنة، *ar-*
matura.

فِلِيس, *f. اِلْفِلِيس*, *ar.* سِتُور, *felis.*

ك cacumen montis.

لُوْمَةٌ *et* لُوْمَةٌ placenta.

جَمِيعٌ tinea, caries, v. s. جَمِيعٌ .

~~lōo~~ mensuræ nomen; *it. ut seq.*

 fornix ; verruca.

لِـهـمـهـةـ, a pers. سُوـشـ vermis
et دُونـ color; color coccineus.

اِنْجَوْسْ, pl. اِنْجَوْسْ ut اِنْجَوْسْ.
اِنْجَوْسْ et اِنْجَوْسْ mespilus arbor.

חַלְא, *fut.* **נָעַמָּה** aggressus
est, ruit, invasit, proterve-
egit, *c.* **וְלֹא**; se audacem præ-
buit, ausus est; appetiit, ir-
ruit, aggressus est, *c.* **וְלֹא**
מֵהֶה נָמַתָּה ausi sunt adime-
re; *cfr. heb.* סִנְחָר et ar. سَنْجَر
cucurrit, institit *rei*, et سَعْيَ
calumniavit.

aggressio, impetus,
audax factum; oppositio, re-
bellio; objectio seu instantia
in argumentatione; argu-
mentum.

جُنُد aggressor, audax.

مَحْبَّاً et مَحْبَّاً f., pl. مَهْبَّة cype-
rus *planta*, ar. سَعْدَان et سَعْدَان ;
radix *cyperi*; radix *eujusvis*
plantæ. مَهْبَّة وَمَهْبَّة , al.
مَهْبَّة , *cyperus planta* (*gall.*
souchet).

فَهُمْ, fut. **فَهُوَ** abhorruit.

Part. pass. ;
horrendus, odiosus.

Pa. **فَحْشَة** fastidium *rei* attulit,
odiosum reddidit; objurgavit.

مُحَمَّدٌ فَوْلًا practiceus; ap. gramm.
مُحَمَّدٌ فَوْلًا nomen actionis.
مُسَمَّدٌ حَذَنَا agendum, factus;
gramm. patiens.
مُسَكَّنٌ حَذَنَا visitatio; actio;
gramm. passio.

مَدْنَا, pl. مَدَنَاتٍ, heb.
سَفَرٌ, ar. pilus, capillus,
crines; pennae avis; trop. fo-
lia arboris. حَمْدًا وَمَدْنَا saccus
e pilis factus. حَمْدًا وَمَدْنَا populus
intonsus crinibus.
مَدَنَاتٍ مَدَنَاتٍ mystax.
capillus gigantis: adian-
tum, filix (gall. capillaire,
fougère). مَهْمَدٌ حَذَنَا apud
alchim., plumbum.

مَهْنَاتٍ, f. et rarius مَهْنَاتٍ,
nom. unitat., unus capillus vel
pilus; pl. مَهْنَاتٍ capilli.
مَهْنَاتٍ, مَهْنَاتٍ pilosus.

مَهْنَاتٍ et مَهْنَاتٍ ut praeced.

مَهْنَاتٍ f., et مَهْنَاتٍ, pl. مَهْنَاتٍ,
مَهْنَاتٍ, heb. شَرَحَة, ar. شَعِيرٌ,
hordeum.

مَهْنَاتٍ hordeaceus.

مَهْنَاتٍ grabatum.

مَهْنَاتٍ, heb. حَذَنَ et ar. سَفَى
fut. مَهْنَاتٍ collegit, accumu-
lavit; redundans fuit. مَهْنَاتٍ
أَبْلَلَ obvelavit, involvit.

Ethpe. أَهَدَفَ pass.

Ethpu. أَهَدَفَ occupatus est,
c. لَّا vel حَ.

مَهْنَاتٍ portatio frumenti ad
aream.

مَهْنَاتٍ, emph. مَهْنَاتٍ, heb. شَدَّهُ,
ar. شَقَّهُ, a rad. شَقَّةٌ, st. est.
مَهْنَاتٍ, pl. مَهْنَاتٍ, مَهْنَاتٍ,
(ar. شَفَرَاتٍ), labium; per ex-
tens. labrum, ora; ripa, lit-
tus, margo; trop. sermo.
مَهْنَاتٍ sub labiis:
submissa voce; adv. كَمَهْنَاتٍ
et مَهْنَاتٍ مَهْنَاتٍ plene, omnino;
مَهْنَاتٍ وَبَوْنَ مَهْنَاتٍ مَهْنَاتٍ Jordana-
nis sui alvei ripas impleverat.

مَهْنَاتٍ, v. s. مَهْنَاتٍ.

مَهْنَاتٍ seria, vas.

مَهْنَاتٍ labiosus, labrosus.

مَهْنَاتٍ labialis.

مَهْنَاتٍ σεπία, sepia piscis (gall.
seiche).

مَهْنَاتٍ, fut. مَهْنَاتٍ jecit; pal-
pitavit; trepidavit, saliit
præ timore; planxit.

Pn. مَهْنَاتٍ saliit, tremuit; tre-
mere fecit.

مَهْنَاتٍ et مَهْنَاتٍ, pers. سَفَيدٌ et سَفَيْدٌ
sinapis alba; cerussa.

مَهْنَاتٍ συγκεδών, corruptio.

مَهْنَاتٍ et مَهْنَاتٍ σποργιγία,
spongia.

مَهْدَهُ مَهْدَهٌ σπούδας, cinis.
 مَهْدَهُ مَهْدَهٌ σπουδή, diligentia, cura.
 مَهْدَهُ مَهْدَهٌ σπόδιον, cinis, scoria
 metallorum.
 مَهْدَهٌ σάπων, sapo.
 مَهْدَهٌ furfur.
 مَهْدَهُ مَهْدَهٌ speculator, *id. q.*
 مَهْدَهُ مَهْدَهٌ.

مَهْلَكَةٌ *inus.*, secuit.

Ethpa. مَهْلَكَةٌ cædit, secuit ;
 it. turpia locutus est.

مَهْلَكَةٌ incisio ; it. cophinus,
 crumena, ar. سَطَنَةٌ, *id. q. pers.*
 سَبَدٌ ; *cfr. مَهْلَكَةٌ.*

مَهْلَكَةٌ proverbium turpe.

مَهْلَكَةٌ, *pers.-ar.* إِسْيَيَاجَ cerussa.

Ethpalp. مَهْلَكَةٌ v. *denom.*
 conversus est in cerussam.

مَهْلَكَةٌ et مَهْلَكَلَةٌ, heb. כְּבָדָה, sapphirus gemma.
 مَهْلَكَةٌ et مَهْلَكَلَةٌ sapphirinus, cæruleus.

مَهْلَكَةٌ σπήλαιον, spelunca.

مَهْلَكَةٌ densus, spissus ; حَتَّا
 مَهْلَكَةٌ مَهْلَكَةٌ caligans nubes.

مَهْلَكَةٌ مَهْلَكَةٌ frequenter.

مَهْلَكَةٌ etc., v. s. مَهْلَكَةٌ.

مَهْلَكَةٌ مَهْلَكَةٌ aristolochia planta
 (gall. rhubarbe).

مَهْلَكَةٌ, fut. مَهْلَكَةٌ arsit ignis ; c.

مَهْلَكَةٌ مَهْلَكَةٌ مَهْلَكَةٌ, incendit, combussit ; trop.
 accensa est *ira.* Part. præt.
 مَهْلَكَةٌ مَهْلَكَةٌ ardens, flagrans.
Ethpa. مَهْلَكَةٌ مَهْلَكَةٌ accensus est ;
 trop. efferbuit ; levis, temerarius fuit ; *cfr. ar.* شَبَّ inflammatus est et juvenis factus est.

Aph. مَهْلَكَةٌ accedit.

مَهْلَكَةٌ et مَهْلَكَةٌ incendium.

مَهْلَكَةٌ مَهْلَكَةٌ protervus, stultus ; it.
 ut مَهْلَكَةٌ .

مَهْلَكَةٌ مَهْلَكَةٌ temere.

مَهْلَكَةٌ مَهْلَكَةٌ facilis ad iram ;
 stultitia.

مَهْلَكَةٌ, heb. כְּבָדָה, limen, porticus ;
 gradus theatri ; gradus ; series lapidum ; *cfr. ar.* سَافَّةٌ et صَفَّةٌ *id.*

مَهْلَكَةٌ, *inus.*; *cfr. heb.* כְּבָדָה contabulavit, *inde part. pass.*

مَهْلَكَةٌ, f. emph. et subst. مَهْلَكَةٌ, heb. כְּבָדָה, ar. سَفِينَةٌ navis, pl. مَهْلَكَةٌ et مَهْلَكَةٌ et مَهْلَكَةٌ .

مَهْلَكَةٌ nauta.

مَهْلَكَةٌ nauticus ; subst. nauta.

مَهْلَكَةٌ مَهْلَكَةٌ ars regendi naves.

مَهْلَكَةٌ nauticus.

مَهْلَكَةٌ palea.

مَهْلَكَةٌ, v. s. مَهْلَكَةٌ .

مَقْمُ medica herba.

مَقْمُ subsellium, sedes; cancelli.

مَقْمُ , pers. سَفِير , ar. سَخَنَار , proxeneta, institutor; al. sensu v. *infra*.

مَقْمُ v. *denom.*, licitatus est, *inde* garrulus fuit.

مَقْمُ garrulitas; mercatus.

مَقْمُ vaniloquium; it. institor.

مَقْمُ astutia; vaniloquium.

مَقْمُ et مَقْمُ f., pers. شَمِيشَر , gr. σαυπίρος , gladius.

مَقْمُ , fut. مَقْمُ , suffecit, satis fuit; capax fuit, potuit, aptus fuit; evacuavit; مَقْمُ vacuitas, vanitas; indigentia; vacatio, otium.

مَقْمُ حَاتِبٌ et بَعْدَ حَاتِبٍ satis fuit in manibus ejus, *inde trop.* valuit, potuit.

مَقْمُ حَاتِبٌ non satis erit in manibus tuis: egenus eris. Part. *præs.*

مَقْمُ sufficiens, par, capax, idoneus. مَقْمُ حَاتِبٌ وَاحْتِبٌ quid facere poteram? اَنْهِيْ وَلَا اَمْهِ nemo comprehendere, assequi potest illud mysterium; it. multus; *adv.*

satis. Part. *pass.* مَقْمُ ,

مَقْمُ vacuus, vanus; otio-

sus; vacans *sedes*; it. egenus.

مَقْمُ حَرْكَمًا orationi vacans.

Ethpe. مَقْمُ vacuus factus est; vacavit, cessavit.

Pa. مَقْمُ evacuavit, exhaust; effudit; vanum reddidit; migravit, c. حَوْلٌ ; cfr. heb. شَفَقٌ , et ar. سَفَقَ effudit; indidit.

Ethpa. مَقْمُ pass. et refl; adaptatus est.

Aph. مَقْمُ vacuum fecit; capacem reddidit.

مَقْمُ حَدْدَمًا sufficientia, capacitas.

مَقْمُ حَدْدَمًا sufficienter, satis.

مَقْمُ حَدْدَمًا sufficiens, par.

مَقْمُ حَدْدَمًا vacuitas, vanitas; indigentia; vacatio, otium.

مَقْمُ حَدْدَمًا vacue, vane; nnq. sufficienter.

مَقْمُ حَدْدَمًا otium, vacatio.

مَقْمُ حَدْدَمًا evacuatio; vomitus.

مَقْمُ حَدْدَمًا evacuans.

مَقْمُ ; cfr. ar. شَفَر , imminuit, resecuit. Part. *pass.* مَقْمُ , tonsus, excisus; al. sensu v. *infra rad.*

Pa. مَقْمُ totondit crines, barbam. Part. *pass.* مَقْمُ , tonsus; tonsura clericali insignitus.

<i>Ethpa.</i> ئَثْبَاتٌ tonsus est ; tonsura clericali insignitus fuit.	مَهْرَبٌ et مَهْرَبٌ litterarius.
ئَثْبَاتٌ tonsura, f. اِلْتَهْرَبَةُ tonstrix.	مَهْرَبٌ , مَهْرَبٌ doctus ; peritus.
اِلْتَهْرَبَةُ tonsura ; status monachalis.	مَهْرَبٌ doctrina ; peritia.
اِلْتَهْرَبَةُ tonsor., f. اِلْتَهْرَبَةُ tonstrix.	اِلْتَهْرَبٌ et مَهْرَبٌ σπειρόχ, cohors.
اِلْتَهْرَبَةُ tonsura ; status monachalis.	مَهْرَبٌ sphericus.
اِلْتَهْرَبَةُ , ar. شَفَرٌ , extremitas, ora, limes, margo, ripa.	مَهْرَبٌ , v. مَهْرَبٌ asparagus.
اِلْتَهْرَبَةُ scoria.	اِلْتَهْرَبٌ , ar. سَقْرَجَلٌ , malum cydonium.
اِلْتَهْرَبَةُ ut seq.	اِلْتَهْرَبٌ basilicum regium.
اِلْتَهْرَبَةُ forfex, novacula, cfr. ar. شَفَرٌ culter.	اِلْتَهْرَبٌ ocymum basilicum.
اِلْتَهْرَبَةُ id. ; fornix.	اِلْتَهْرَبٌ ut اِلْتَهْرَبٌ spatharius, armiger.
اِلْتَهْرَبَةُ , assyr. sipru, heb. סִפְרָה , ar. سِفَرٌ , scriptura, spec. liber, scriptum ; ars legendi, scribendi ; sermo.	اِلْتَهْرَبٌ σπαθιστήρ , instrumentum chirurgicum.
اِلْتَهْرَبَةُ vel اِلْتَهْرَبَةُ Liber Genesis. مَهْرَبٌ وَّهَرَبَتْ vel liber Chroniconrum. مَهْرَبٌ وَّهَرَبَتْ liber gestorum. مَهْرَبٌ liber ritae : sanctorum diptycha.	اِلْتَهْرَبٌ imper. v. مَهْرَبٌ .
اِلْتَهْرَبَةُ مَهْرَبٌ liber annalium.	اِلْتَهْرَبٌ heb. סַכְעָה , saccus, cilium.
اِلْتَهْرَبَةُ مَهْرَبٌ schola.	اِلْتَهْرَبٌ vox lat., sicarii.
اِلْتَهْرَبَةُ studens legi, libris ; pler. subst., scriba, legisperitus ; scriptor, praeceptor, f.	اِلْتَهْرَبٌ vulnus ; ulcus.
اِلْتَهْرَبَةُ .	اِلْتَهْرَبٌ pers. - ar. سَكْبَاجِيٌّ , acidi cibi species.
اِلْتَهْرَبَةُ ars scribæ ; litteratura.	اِلْتَهْرَبٌ , v. s. اِلْتَهْرَبَةُ .
	اِلْتَهْرَبَةُ مَهْرَبٌ σίκυος , colocynthis ; amaritudo.
	Pa. اِلْتَهْرَبٌ v. denom., amarum fecit, exacerbavit, vexavit.
	اِلْتَهْرَبَةُ مَهْرَبٌ amarus, exacerbans, molestus.
	اِلْتَهْرَبَةُ مَهْرَبٌ σκελετός , skeletus, mortui ossium compago.

الْمَوْتَى	al.	مَوْتَى	malus navis.	مَوْتَى	άσκιαστος	ascius, sine umbra.	
فَرِيقَة		سَخَّنَتِي	tutamen.	فَرِيقَة	άσκητής	asceta.	
فَرِيقَة		سَخَّنُوك	vas, instrumen- tum.	فَرِيقَة	سَخَّلَلَخ	scilla <i>planta</i> .	
فَرِيقَة		سَخَّنَجَجَج	et سَخَّنَجَج	فَرِيقَة	سَخَّنَجَج	crocodilus niloticus; scincus <i>piscis</i> .	
فَرِيقَة		سَخَّرَدَوْن	scordium, allium sylvestre.	فَرِيقَة	سَخَّنَوْمَعَ	habitatio.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	lat., excubitores. فَرِيقَة	سَخَّنَهَلَلَه	سَخَّنَهَلَلَه	tentorium.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	serpentis species.	فَرِيقَة	سَخَّنَهَلَلَه	sce- trum.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	tenebræ.	فَرِيقَة	سَخَّنَهَلَلَه	ascia, securis.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	socotri- num, genus aloes.	فَرِيقَة	سَخَّنَهَلَلَه	pullus dorcadis.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	pumilus, cfr. ar. طَبَقَة, abortivus; it. sporta, cophinus; flagellum; strigili- lis.	فَرِيقَة	سَخَّنَهَلَلَه	سَخَّنَهَلَلَه	(gall. squirre).
فَرِيقَة		سَخَّنَهَلَلَه	capra montana.	فَرِيقَة	سَخَّنَهَلَلَه	ar.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	سَخَّنَهَلَلَه	فَرِيقَة	سَخَّنَهَلَلَه	polivit; trop. or- navit. Part. pass. فَرِيقَة	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	ele- gans, politus; al. sensu v. s. rad. فَرِيقَة.	فَرِيقَة	سَخَّنَهَلَلَه	ornata;	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	ethpe. فَرِيقَة	فَرِيقَة	سَخَّنَهَلَلَه	polit. ornata;	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	pass.	فَرِيقَة	سَخَّنَهَلَلَه	elegantia; it. siclus.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	Pa. فَرِيقَة	فَرِيقَة	سَخَّنَهَلَلَه	politio, ornatus; it. vox	
فَرِيقَة		سَخَّنَهَلَلَه	Peal.	فَرِيقَة	سَخَّنَهَلَلَه	lat. scala, stapes.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه		فَرِيقَة	سَخَّنَهَلَلَه	expolitor.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه		فَرِيقَة	سَخَّنَهَلَلَه	politio; elegantia.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه		فَرِيقَة	سَخَّنَهَلَلَه	ornatus.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه		فَرِيقَة	سَخَّنَهَلَلَه	ornator.	
فَرِيقَة		سَخَّنَهَلَلَه		فَرِيقَة	سَخَّنَهَلَلَه	ornatui inserviens.	

مَحْمَدَةٌ strabismus.	ravit, stulte locutus est ; calumniatus est ; contendit, adversatus est.
مَحْمَدَنْتَى contemptor.	
مَحْمَدَةٌ neolog.greec.σκηνιζωνες, satellites.	
مَحْمَدَةٌ et مَحْمَدَةٌ, pers. سَكَرَجَةٌ, paropsis.	
مَحْمَدَةٌ vox lat., tribunal juridicum.	مَهْمَدَةٌ vaniloquium ; contention.
مَحْمَدَةٌ مَحْمَدَةٌ σκάριτρος, delineatio.	مَهْمَدَةٌ vaniloquus.
مَهْمَدَةٌ, et communius مَهْمَدَةٌ, fut.	مَهْمَدَةٌ præcipitanter de loquela.
مَهْمَدَةٌ, fœtuit, putruiit ; cfr, ar. صَرِيَ putruiit aqua, lac.	مَهْمَدَةٌ vaniloquium, calumnia.
مَهْمَدَةٌ مَهْمَدَةٌ jam fœtet.	مَهْمَدَةٌ loquax ; importunus.
Part. præt. مَهْمَدَةٌ, pl.	مَهْمَدَةٌ, ar. شَرَابٌ, aqua mulsa, syrupus (gall. sirop), cfr. مَهْمَدَةٌ.
مَهْمَدَةٌ, emph. مَهْمَدَةٌ, f. emph.	مَهْمَدَةٌ palus, suds vitis.
مَهْمَدَةٌ, pl. مَهْمَدَةٌ, emph.	
مَهْمَدَةٌ fœtens, putridus ; turpis.	مَهْمَدَةٌ, ar. شَرَجَةٌ et شَرَاجَةٌ, nxuit, implicavit, texuit ; trop. disposuit. Part. pass. مَهْمَدَةٌ, f. مَهْمَدَةٌ contextus, in f. subst. v. infra.
Ethpe. مَهْمَدَةٌ putruiit.	Ethpe. مَهْمَدَةٌ pass.
Pa. مَهْمَدَةٌ putrescere fecit ; it. ut Peal.-Part. pass. مَهْمَدَةٌ fœtidus.	Pa. مَهْمَدَةٌ ephippio instruxit equum ; trop. induit arma ; it. disposuit.
Aph. مَهْمَدَةٌ fœtidum reddidit ; it. fœtuit.	Ethpa. مَهْمَدَةٌ ephippio instructus est ; connexus est.
مَهْمَدَةٌ putredo, fœtor ; sanies, sordes ; mucus. مَهْمَدَةٌ وَمَهْمَدَةٌ graveolentia. مَهْمَدَةٌ وَمَهْمَدَةٌ sentina.	مَهْمَدَةٌ ephippii impositio.
مَهْمَدَةٌ, ar. شَرَبٌ, cypressus.	مَهْمَدَةٌ, ar. شَرَبٌ, ephippium, stratum.
مَهْمَدَةٌ, fut. مَهْمَدَةٌ blate-	مَهْمَدَةٌ porticus, porticus cancellis instructus.
	مَهْمَدَةٌ ephippiorum confector, ar. شَرَاجٌ ; it. ut seq.

الْمُهْنَدَةُ ، pl. الْمُهْنَدَاتُ tudicula, cochleare; paropsis.

الْمُهْنَدَةُ ، pl. الْمُهْنَدَاتُ textum quid; rete; reticulum *capitis*; storea, teges; saccus e foliis palmae contextus, ar. شَرِيجَةٌ .

الْمُهْنَدَةُ implicate.

الْمُهْنَدَةُ ephippii impositio.

الْمُهْنَدَةُ instratus equus.

الْمُهْنَدَةُ instructio equi cum ephippio.

الْمُهْنَدَةُ ، pl. الْمُهْنَدَاتُ et الْمُهْنَدَاتُ ،

pl. الْمُهْنَدَاتُ ، it. الْمُهْنَدَاتُ ,

الْعَسْيَانُ fistula *ulcus*, haemorrhoides.

الْمُهْنَدَةُ scripsit, denom. *a seq.*

الْمُهْنَدَةُ linea, versus; catalogus, calendarium; narratio.

الْمُهْنَدَةُ metricus.

الْمُهْنَدَةُ regula ad ducendas lineas.

الْمُهْنَدَةُ , fut. وَهَنَّ expavit,

tremuit; vagatus est, fugax fuit; cfr. heb. טָרֵד et ar. شَرَد

aufugit. Part. præter. مُهْنَدَةً ,

الْمُهْنَدَةُ expavescens; inde spec. ut heb. שְׁרִיד , superstes

a clade, residuus, profugus, ar. شَرِيد; pauci, reliquiae *rei*;

semen *viri*, ejus posteri.

Pa. الْمُهْنَدَةُ tremefecit, terruit.

Part. act. مُهْنَدَةٌ ; terribilis.

Ethpa. الْمُهْنَدَةُ pass.; part.

مُهْنَدَةٌ pro مُهْنَدَةٍ يَهُنَدَةٌ territus es, tremis.

مُهْنَدَةٌ et مُهْنَدَةٌ pavor.

مُهْنَدَةٌ , pl. مُهْنَدَاتٌ terror; it. in

pl. dies priores caniculæ.

مُهْنَدَةٌ in hoc terribili transitu *judicii ultimi*.

مُهْنَدَةٌ terrificus.

مُهْنَدَةٌ terribilis.

مُهْنَدَةٌ terrifactio, terroris incussio.

مُهْنَدَةٌ id.

مُهْنَدَةٌ perterritus.

مُهْنَدَةٌ trepidatio.

مُهْنَدَةٌ , ar. سِرَد , cribrum.

مُهْنَدَةٌ scintilla.

مُهْنَدَةٌ , pers. - ar. سِرَدَاب , locus subterraneus.

مُهْنَدَةٌ et مُهْنَدَةٌ , sardius gemma.

مُهْنَدَةٌ id; insuper elaterium, pharmaceum abortivum.

مُهْنَدَةٌ مُهْنَدَةٌ sardonyx gemma.

مُهْنَدَةٌ , Saphel v. مُهْنَدَةٌ .

مُهْنَدَةٌ , fut. مُهْنَدَةٌ læsit,

damnum intulit, corruptit, absumpsit, destruxit; c. مُهْنَدَةٌ ,

invasit; intr. deliquit, pecca-

vit, adulterium commisit ;
ninq. ut Aph. protulit, conces-
 sit. مختصر حفظه حفظه inquinavit ensem sanguine ; *cfr. pro*
variis sensibus varias signific.
ar. شرخ, libere ivit ad pas-
 tum *pecus*, etc., et شرخ a-
 peruit, secuit, explicavit, *it.*
heb. סרחה effusus est. *Part.*
pass. مختصر مختصر ; *adj.* de-
 pravatus, pravus ; ordinatus ;
pl. f. مختصر res pravæ.
 مختصر أقحصه مختصر episcopus
 consecratus.

Ethepe. مختصر pass.

Pa. مختصر destruxit, perdidit,
 vitiavit ; dilaniavit, discer-
 psit ; inquinavit *sanguine*.

Ethpa. مختصر pass.

Aph. مختصر dimisit ; immisit,
 laqueos, ictus ; deformavit,
 corrupti ; emisit, obtulit ; de-
 signavit, proposuit ; protulit,
 dedit ; edidit *scripta* ; expli-
 cavit, *ar.* شرخ ; constituit *re-*
gem, ordinavit *clericos*, etc. ;
ninq. ut Pa. مختصر سقطه
 suas cogitationes sedavit.
 مختصر فدحه vel فدحه
 وفهه responsum dedit. مختصر
 preces pro aliquo
 effudit. مختصر مفهه veniam
 concessit.

Ettaph. مختصر propositus
 est, constitutus est ; ordina-
 tus est *clericus*. مختصر
 أقحصه مفهه consecratus est
 episcopus.

مختصر corruptio.

مختصر حفظه سدا corruptio, damnum, ex-
 cidiun, destructio ; vitium,
 culpa, malitia.

مختصر مفهه سدا , pl. مختصر مفهه سدا , f. مختصر مفهه سدا nocivus,
 exitiosus ; improbus, malefac-
 tor. مفهه سدا مفهه سدا maligni
 spiritus.

مختصر مفهه سدا sæve.

مختصر مفهه سدا corruptio, deprava-
 tio.

مختصر مفهه سدا sæve.

مختصر مفهه سدا corruptio, turpitude.

مختصر مفهه سدا corruptio, perdi-
 tio ; dilaceratio.

مختصر مفهه سدا corruptor.

مختصر مفهه سدا depravatio, damnum.

مختصر مفهه سدا concessionary ; ordinator.

مختصر مفهه سدا oblatio, munus ; peti-
 tio ; electio, ordinatio, con-
 secratio.

مختصر مفهه سدا , pl. مفهه سدا
 phiala.

مختصر مفهه سدا corruptus.

مختصر مفهه سدا ordinandus.

مختصر مفهه سدا ordinatio recepta ;
 electio.

مُنْتَهٰ et مُنْتَهٰ, fut. مُنْتَهٰ, heb. شَرَطَ, ar. شَرَطَ, incidit cu-
tem; delineavit, scripsit, ar.
سَطَرَ. Part. pass. مُنْتَهٰ exa-
ratus.

Ethpe. مُنْتَهٰ pass.

Pa. مُنْتَهٰ scalpsit, laceravit;
scripsit.

Ethpa. مُنْتَهٰ pass.

مُنْتَهٰ scarificatio; acumen
sagittæ.

مُنْتَهٰ id.; scriptio.

مُنْتَهٰ, pl. مُنْتَهٰ et مُنْتَهٰ
linea, lineamentum; cfr. ar.
سَطَرَ; ap. gramm. apex, li-
neola; in pl. litteræ, charac-
teres, scripta. مُنْتَهٰ اَوْمَارًا
linea recta.

مُنْتَهٰ dim., lineola.

مُنْتَهٰ ut مُنْتَهٰ; it. incisio.

مُنْتَهٰ dim., lineola.

مُنْتَهٰ, مُنْتَهٰ scriptor.

مُنْتَهٰ, ar. سَرَطَان, cancer
animal et morbus; signum
Zodiaci.

مُنْتَهٰ tortuose, ad instar
incessus cancri.

مُنْتَهٰ, ar. مِشَاطَ, scalpellum.

مُنْتَهٰ dilaceratus, dissec-
tus.

مُنْتَهٰ laceratio.

مُنْتَهٰ, v. s. مُنْتَهٰ.

مُنْتَهٰ et مُنْتَهٰ, heb. شَرَطَ,
fut. مُنْتَهٰ, adhæsit, conjunc-
tus est, implicatus est; cfr.
مُنْتَهٰ et ar. شَرَطَ se conjunxit.
Ethpe. مُنْتَهٰ id.

Pa. مُنْتَهٰ adhærere fecit; it.
ut Peal.

Ethpa. مُنْتَهٰ conjunctus est.

مُنْتَهٰ adhæsio, implicatio.

مُنْتَهٰ, مُنْتَهٰ adhæsivus; ad-
hærens.

مُنْتَهٰ adhæsio.

مُنْتَهٰ, مُنْتَهٰ conjunctus, adhæ-
rens, implicatus.

مُنْتَهٰ adhæsio; inclinatio, c.
حَدَّةٌ; it. planta spinosa quæ
vestibus viatoris se implicat.

مُنْتَهٰ, ar. سَرَمَ et سَرَمَ, fut,
مُنْتَهٰ fidit, spec. mucronem
nasi resecuit. Part. pass.
مُنْتَهٰ, مُنْتَهٰ simus.

مُنْتَهٰ resectio, spec. nasi.

مُنْتَهٰ garrulus, impudens.

مُنْتَهٰ loquacitas, impuden-
tia.

مُنْتَهٰ, مُنْتَهٰ simus.

مُنْتَهٰ status simi; mutilatio
nasi.

مُنْتَهٰ, مُنْتَهٰ simus.

مُنْتَهٰ, pers. سَرَقَ, ar. سَرَقَ,
atriplex hortensis.

מְתַנָּה, *pl.* מְתַנָּה axis, circulus ; genus tormenti. מְתַנָּה וְלִבְנָה suos axes volvit : prosper fuit, viguit.

מְתַנָּה inus.-*Pa.* מְתַנָּה cas travit ; *it.* plexit, contexuit.

Ethpa. מְתַנָּה pass.

מְתַנָּה et מְתַנָּה castratus ; eunuchus ; *cfr. heb.* סְרוּס *et ar.* سَرِيس *id.*

מְתַנָּה castratus, eunuchus ; *it.* castratio.

מְתַנָּה castratus, eunuchus ; מְתַנָּה princeps eunuchorum.

מְתַנָּה inscite scripsit ; *cfr.* מְתַנָּה .

מְתַנָּה filum.

מְתַנָּה, *pl.* מְתַנָּה לְדָא in-gluvies avium.

מְתַנָּה vestimentum detritum ; lucanica (*gall. saucisse*).
י

מְתַנָּה, *fut.* מְתַנָּה præfocavit cibus ; mutilavit, confregit. *Part. pass.* מְתַנָּה, מְתַנָּה . מְתַנָּה mutilatus aure.

מְתַנָּה præfocatio ; *it.* ut seq. מְתַנָּה penna sagittæ.

מְתַנָּה propagavit, germina-

vit, *cfr.* מְתַנָּה divisit, *et Pi.* heb. v. סְנַק amputavit ramos ; *it.* ap. gramm. flexit ; *cfr. ar.* صَرْفَ id.

Ethpa. מְתַנָּה pass.

מְתַנָּה et מְתַנָּה ramus ; virgultum ; *cfr. heb.* סְנַעֲוָה et סְנַעֲוָה rami, *et ar.* סְנַעֲוָה rami palmae.

מְתַנָּה ramificatio, summa ramorum ; flexio verborum (*ar.* تَسْرِيف).

מְתַנָּה , *fut.* מְתַנָּה absorpsit, consumpsit ; *it.* obstruxit.

Ethpe. מְתַנָּה obstructus est.

Pa. מְתַנָּה avide sorbuit.

Aph. מְתַנָּה sorbere fecit.

מְתַנָּה , *it.* מְתַנָּה , *pl.* מְתַנָּה haustus, absorptio ; *id quod sorbetur.*

מְתַנָּה sorbens.

מְתַנָּה haustus, sorbitio.

מְתַנָּה sorbitio ; *id quod sorbetur, polenta ; cf.* מְתַנָּה .

מְתַנָּה , *pl.* מְתַנָּה , emph. מְתַנָּה , שָׁרָפִים , Seraphim, *ordo Angelorum.*

מְתַנָּה , pers. מְתַנָּה , mitra, pileus, cedaris.

מְתַנָּה , *heb.* שְׁרֵך , *fut.* מְתַנָּה

pexit lanam, compsit crines; pectine ferreo dilaniavit, discerpsit; cfr. ar. شرقَ secuit. Part. pass. مُتَمَّثِّمٌ, مُتَمَّثِّمٌ pl. مُتَمَّثِّمٌ spec. usurpat. adjct. vacuus, inanis; vanus, inutilis, impar rei; subst. in pl. f. vana, vanitates, inde idola. إِنْتَمَا مُتَمَّثِّمٌ homines inanes, desides.

Ethpe. مُتَمَّثِّمٌ pectinatus est, dilaniatus est; it. exinanitus est, se exinanivit, se privavit, voluntariam paupertatem, monasticam vitam professus est; caruit.

Pa. مُتَمَّثِّمٌ evacuavit vas, terram incolarum dispersione; spoliavit, exuit; evacuare fecit; cfr. ar. شرقَ furatus est, spoliavit. مُتَمَّثِّمٌ mandatum irritavit, abrogavit rex. مُتَمَّثِّمٌ semctipsum exinanivit. أَوْتَاراً مُتَمَّثِّمٌ evomuit terra habitatores suos. Part. pass. مُتَمَّثِّمٌ, مُتَمَّثِّمٌ; vacuus, inanis, carens; pauper voluntarius, religiosus. حِلَالَاتٍ مُتَمَّثِّمٌ vanae rationes.

Ethpa. مُتَمَّثِّمٌ pass. et refl.; eguit. مُتَمَّثِّمٌ se exuit h. e. renuntiavit mundo.

Ethpau. مُتَمَّثِّمٌ obnubilatus est, denom. a مُتَمَّثِّمٌ.

أَمْتَهْنَةٌ pectinatio, dilaceratio; evacuatio; it. ut seq.

مُتَمَّثِّمٌ pecten; pecten tortoris.

أَمْتَهْنَةٌ pectinatio, dilaceratio.

مُتَمَّثِّمٌ pectens.

أَمْمَوْنَةٌ pecten carminatoris; rostrum aratoris.

أَمْتَهْنَةٌ et مُتَمَّثِّمٌ nebula.

مُتَمَّثِّمٌ vacue, frustra, vane.

أَمْتَهْنَةٌ vacuitas, vanitas; adverb. præc. & vel ـ, frustra;

مُتَمَّثِّمٌ مُتَلَّا vaniloquium.

مُتَمَّثِّمٌ مُتَمَّثِّمٌ vana de se opinio.

أَمْتَهْنَةٌ et مُتَمَّثِّمٌ id quod in pectinatione decidit, stupra.

مُتَمَّثِّمٌ evacuatio, exinanitio; paupertas, spec. voluntaria.

أَمْتَهْنَةٌ, ar. شرقٌ, مُتَمَّثِّمٌ, مُتَمَّثِّمٌ, orientalis; saracenus.

أَمْتَهْنَةٌ religio Saracenorum.

أَمْتَهْنَةٌ et مُتَمَّثِّمٌ pecten, hamus ferreus; it. venæ exteriore manuum et pedum (ar. لَحْيَ).

مُتَمَّثِّمٌ more pauperum.

أَمْتَهْنَةٌ abnegatio, paupertas monastica; evaeuatio.

أَمْتَهْنَةٌ evacuans.

أَمْتَهْنَةٌ qui exhaustiri potest.

أَمْتَهْنَةٌ لا مُتَمَّثِّمٌ inexhaustus.

مَهْمَّةٌ مُهْمَّةٌ exhaustio, evacuation.

مَهْمَّةٌ, pers. - ar. سَرِيجَةٌ, unde gr. σίρικον, minium, rubrica; cfr. rad. aram. קְרַבָּה rubuit. **مَهْمَّةٌ** σαρκοκόλλα, sarcocolla gummi.

مَهْمَّةٌ, ar. سَرِيقَةٌ, pers. سَرِيجَةٌ, finus, stercus.

مَهْمَّةٌ pravus; cfr. ar. شَرِسٌ, pravus fuit.

مَهْمَّةٌ, v. infra.

مَهْمَّةٌ, heb. חֵמֶת, ar. شَتَاءٌ, hiems; procella.

Aph. مَهْمَّةٌ v. denom., hiemavit, hibernavit.

مَهْمَّةٌ, مَهْمَّةٌ hiemalis.

مَهْمَّةٌ مُهْمَّةٌ hiematio.

مَهْمَّةٌ tiara.

مَهْمَّةٌ στύγος, linea, versus.

مَهْمَّةٌ ferrum, acies; cfr.

مَهْمَّةٌ chalybs, et ar. سَطْرٌ acies gladii.

Pa. مَهْمَّةٌ v. denom., faber ferrarius fuit.

مَهْمَّةٌ, fut. مَهْمَّةٌ, inf.

مَهْمَّةٌ evertit, subvertit; rejectit; confutavit; calumniavit, maledixit; it. recruduit vulnus; cfr. talmud. סִתְרָה demolitus est, et ar. סִתְרָה secuit,

læsit; it. texit, abscondit; trop. protexit; cfr. heb. כְּתָרָה, et ar. סִתְרָה obtexit. Part. pass.

مَهْمَّةٌ, مَهْمَّةٌ destructus; it. occultus; cfr. ar. سَيِّرٌ; in pl. subst. occulta, arcana.

Ethpe. مَهْمَّةٌ destructus est, calumnia affectus est; it. se abscondit; recruduit vulnus; trop. protectus est.

Pa. مَهْمَّةٌ texit, celavit, abscondit, c. acc. vel مَهْمَّةٌ; protectit, defendit c. acc. vel مَهْمَّةٌ aut مَهْمَّةٌ. Part. act. et pass. مَهْمَّةٌ, f. مَهْمَّةٌ; adject. tutus; pl. f. مَهْمَّةٌ مَهْمَّةٌ occulta, secreta.

Ethpa. مَهْمَّةٌ pass. et reflex. formæ Pa. مَهْمَّةٌ مَهْمَّةٌ se abscondit sub ala ejus: ad eum configit; it. vestes induit, c. مَهْمَّةٌ.

مَهْمَّةٌ et مَهْمَّةٌ destructio; confutatio; calumnia.

مَهْمَّةٌ absconsio; secretum; velum, ar. سَيِّرٌ; adverb. c. مَهْمَّةٌ, clam; it. ut مَهْمَّةٌ.

مَهْمَّةٌ destructor; calumniator.

مَهْمَّةٌ secreto.

مَهْمَّةٌ absconsio, status absconditus.

مَهْمَّةٌ protectio; Completorium, pars Officii ecclesiastici

sic vocata a psalmo tunc recitato, et his verbis incip. : حَسْدُ وَمَنْهَا in protectione Altissimi, (ar. صَلَةُ الْبَسْتَارِ). حَسْدًا protectio, spec. adjutorium, refugium ; velum, ar. بَسْتَار.

حَسْدًا destructor.

حَسْدًا وَأَنَّ secreto, clanculum.

حَسْدًا absconsio.

حَسْدًا وَنَّ protector.

حَسْدًا وَنَّ protectio, refugium.

حَسْدًا وَنَّ qui dirui potest.

حَسْدًا وَمَنْهَا vox lat., strigilis.

حَسْدٌ, *nng.* حَسْدٌ *f.*, contr. a

حَسْدًا , cfr. heb. חַסְדָּא , firmavit, et **وَصَدَ** firmus fuit, *pl.* حَسْدَاتٍ , حَسْدًا , vitis, surculus ; *it.* mortarium ; modius, ar. صَاعٌ , cfr. حَسْدًا et حَسْدًا s. حَسْدًا.

Pa. حَسْدٌ denom., firmavit, stabilivit ; firmiter plantatus est ; cfr. heb. חַזְקָה collocavit.

Part. pass. حَسْدًا , حَسْدًا , f. emph. حَسْدَةً ; *adj.* firmus.

Ethpa. حَسْدٌ firmatus est ; radicatus est.

حَسْدٌ , حَسْدٌ stabilimentum.

حَسْدٌ stabilitas ; confirmatio ; حَسْدٌ وَمَنْهَا ī inconstantia.

حَسْدٌ fundator.

11

¶ Syrorum littera sexta decimalis; $v = 70$; $\dot{v} = 700$; \ddot{v} = septuagesimus.

1º Equivalet heb. נָהַר, נָהָר densus fuit, et ar. نَهْرُ et نَهْرٌ, id. q. نَهْرٌ sollicitus fuit, et نَهْرٌ cantavit, it. نَهْرٌ nevit, etc.

2º Permutat rarius c. guttur.
 س, nnq. c. palat. ه; حفف,
 heb. הַכְּל complexus est :
 شهْوَمًا et شهْوَحًا balbuties ;
 nnq. c. ل et ل : مَنْتَهٌ et مَنْتَهٌ شهْوَحًا
 flavus, حَكْلًا et حَكْلَهُ turbo.
 Respondet nnq. ar. ص, et
 heb. ح : حُسْنٌ ضاق, anxius
 fuit, heb. חֹזֶק angustiae ; حָנָן,
 ar. حَنَنَ, ar. ضأن ovis ; حُوكָם, heb.
 أَرْض, ar. أَرْض, terra ; حَمْدَانَا,
 بيضة ovum ; cfr. حَوْلَهُ id. q.
 رَبْعَة, ar. رَعَى pastum ivit, et si-
 mul heb. حَذَّه, ar. حَذَّه contenus
 fuit, acquievit. Tandem,
 minuitur in l : cfr. heb. حَزَّ,
 ar. حَزَّتْش, et حَوْلَهُ occurrit ; it.
 cfr. حَمْهَه, ar. قَزْع cucumis.

3º Pronuntiatur uti σ et ς;
 seq. vero οι lenitur in l, v. g.
 ḡ̄d̄ (éhad). It.ap. Nestorianos,
 seq. ω in medio vocis pro-
 nuntiatur uti ω, v. g. مَحْمَدٌ
 (مَهْمَدُهُ) investigatus.

4º Coalescunt duo & in unum
in numeris compositis, v. g.
١٣٤ quatuordecim pro-

حَدَّافٌ festum, v. inf. rad.
حَدَّافٌ .
حَدَّالٌ, ar. ضَالٌ, rubus.
حَفَّ, v. دَافَا .

حَدَّا et حَدَّ, heb. עֲבָה, fut. نُحَدَّ durus, spissus fuit;
 intumuit. Part. præt. حَدَّا, emph. حَدَّادًا, pl. m.
 حَدَّا, f. emph. حَدَّةً, emph. حَدَّةً, f. emph. حَدَّةً,
 emph. حَدَّةً, densus, spissus;
 crassus, informis; tumidus;
 trop. rudis, stolidus, cfr. ar.
 غَيْ ; it. apud gramm., gravis
 sonus aut littera. حَدَّةً
 corpora materialia. أَلْوَانُ حَدَّا
 locus incultus.

Ethpe. حَلَّ id. q. Peal.

Pa. حَدَّ induravit, condensavit. *Part. pass.* مَهْدَدٌ, مَهْدُومٌ densus, spissus.

Ethpa. أَنْجَحَ pass. ; intumuit ; materia seu carne indutus est.

Aph. أَحْجَحَ densavit, spissavit. حَحْنَا crassitudo, densitas ; tumor.

حَحْنَةٌ crasse, inepte.

حَحْنَةٌ inflatio, tumor ; lutum, cœnum.

حَحْمَاءٌ ut حَحْمَاءٌ ; trop. stupiditas, stoliditas, ar. غَبَّةٌ ; ap. gramm., gravitas soni, litteræ.

حَحْمَاءٌ, ar. عَبَّةٌ, pallium, tunica grossior.

حَحْمَةٌ tumor ; inflammatio gutturis.

حَحْمَتَةٌ, pl. حَحْمَتَاتٌ tumidus ; inflammatus.

حَحْمَةٌ crassitudo.

حَحْمَتَةٌ crassus.

حَحْمَاءٌ, neo-ar. عَبَّ, sinus ; uterus, vulva ; cavitas, sinus maris, ipsum mare, ar. غَبَّ ; trop. gremium seu fontes baptismi ; it. saceculus.

حَحْمَتَةٌ ad sinum pertinens.

حَحْمَةٌ lacerta, cfr. أَحْمَاءٌ et ar. ضَبَّ.

حَحْمَاءٌ cornu ; per extens. tuba, cfr. أَحْمَاءٌ.

حَدَّ, v. s. حَحْنَا.

حَدَّ, c. suff. حَجْمَتَةٌ illæ fecerunt hanc rem, fut. حَجْبٌ, imp. حَجْبٌ, c. suff. حَجْبَتِينَ fac illud, pl. حَجْبَتِينَ, heb. نَعَدَ, fecit, egit, operatus est, perfecit, artem exercuit ; paravit victimam offerendam aut manducandam ; reparavit ; reconciliavit, seq. مَكْفُداً ; constituit regem, etc. ; instituit, decretit, curavit ut ; peregit tempus ; composuit scriptu ; celebravit festum, sacram Missam. حَجْبَتِينَ vel حَجْبَتِينَ certamen, bellum commisit. حَجْبَتِينَ diligentiam fecit ; instituit rei, c. حَجْبَتِينَ constituit, consilium cepit. حَجْبَتِينَ judicium exercuit, vindicavit. حَجْبَتِينَ benefecit, gratiam præstavit. حَجْبَتِينَ ad perniciem duxit. حَجْبَتِينَ sibi nomen fecit, suum nomen in posteros transmisit. حَجْبَتِينَ sermonem habuit, promissa opere complevit ; obedivit, morem gessit. حَجْبَتِينَ facultatem concessit. حَجْبَتِينَ simulavit. finxit se esse. حَجْبَتِينَ populum

commovit contra. حَجَّ خَدْمًا rationem prætexuit. حَجَّ فَهُنَّا responsum dedit. حَجَّ مَنْتَهِيَّا pericula subiit. حَجَّهُمْ وَهُنَّا eum dominum principemque constituit. حَجَّ وَمَا initium duxit. حَجَّهُمْ وَمَا præposuit. حَجَّهُمْ eum nationibus præfecit. حَجَّهُمْ وَإِلَيْهِا sacra mysteria peregit ; it. consilium iniit. حَجَّهُمْ subjecit. حَجَّهُمْ لَوْنَا portam occlusit. مُ حَجَّهُمْ quid agere debuisse ? Part. act. حَجَّ ، حَجَّا ; adj. utilis, aptus rei ; ap. gramm., agens, subiectum ; حَجَّهُمْ simulator. حَجَّهُمْ benefactor. حَجَّهُمْ malefactor, malignus. حَجَّهُمْ وَهُنَّا vices personæ gerens. حَجَّهُمْ كَفَهُمْ uti nugaces nos æstimant. Part. pass. حَجَّهُمْ ، حَجَّا ; subst. creata res, creatura ; ap. gramm., participium passivum, ar. إِنْسَمُ الْمَفْعُولِ () ; it. obiectum propositionis, (id. q. ar. حَصْبُهُ) ; f. emph. حَحْبَهُا ; subst. factum, res, opus, negotium, pl. حَحْبَهُا gesta, facinora. حَحْبَهُمْ كَ a me factum est : feci, uti حَحْبَهُمْ . حَحْبَهُمْ مُهْلَهُمْ وَحَحْبَهُا

quid agunt: quomodo valent?
male se habet.

Ethpe. إِثْبَهُ pass.

Pa. حَجَّ denom. a حَجَّا , id. q. usit. حَجَّهُمْ .

*Aph. أَحَبَّ operari fecit, inde impulit, sollicitavit, incitavit, ursit ; vexavit *diabolus* ; it. egit, operatus est, effecit.*

Part. act. مَحْبَهُا im-pellens, urgens ; necessarius.

مَهْ لَوْنَا مَحْبَهُا necesse habebat, debebat.

Ettaph. إِتْتَهَبُهُ pass.

Palp. حَجَّهُمْ in servitutem subegit ; sibi aliquem muneribus devinxit ; affixit.

Ethpalp. إِثْهَبُهُمْ in servituti subiectus est, servivit.

Schap. حَجَّهُ servire fecit, subegit. Part. pass. مَحْبَهُ ، مَهْلَهُا subjectus ; obnoxius ; subditus, mancipium.

Eschtuph. إِسْتَهَبُهُ pass. et refl. ; obedivit.

حَجَّهُا ، حَجَّا actio, opus, facinus ; labor ; effectio, creatio ; adminisitratio, exsecutio ; negotium, res ; opes, provincia, (cfr. ar. أَعْمَالُ الْبَلْدِ provinciæ regionis) ; sarcinæ ; ap. gramm., actio verbo expressa. مَهْلَهُمْ وَحَحْبَهُمْ verbum ac-

tivum. حَبْـبـاً وَأَبْـمـا fructus manuum seu operis ; it. opera manualia. حَكْـبـاً لـ ad effectum venit, effectum habuit res, promissio. نـفـسـ حـكـبـاـ vel آمـمـ حـكـبـاـ مـعـ حـكـبـاـ ad effectum adduxit ; adv. حـكـبـاـ, id. q. seq.

حـبـبـاـ مـعـنـمـ actu, reapse, revera. حـبـبـاـ possessio, opes ; sarcinae.

حـبـبـاـ , pl. حـبـبـاـ servus, mancipium ; minister, satellites ; in pl. etiam milites. حـبـبـاـ مـلـكـاـ , pl. حـبـبـاـ servus regis ; regulus. حـبـبـاـ وـلـهـاـ Dei cultor.

حـبـبـاـ dim., servulus.

حـبـبـاـ servilis.

حـبـبـاـ et حـبـبـاـ serviliter. حـبـبـاـ , حـبـبـاـ ar. غـيـرـيـةـ .

حـبـبـاـ , f. حـبـبـاـ operator, opifex, fabricator ; Creator ; cultor legis ; operans, efficiens causa ; ap. gramm. agens seu subjectum (id. q. ar. التـاعـلـ). مـلـاـ حـبـبـاـ . (الـتـاعـلـ) verba activa.

حـبـبـاـ realiter ; gramm., transitive.

حـبـبـاـ operatio, effectio, efficientia ; creatio ; ap. gramm.,

qualitas agentis seu subjecti, forma activa verbi.

حـكـبـاـ activus, ap. gramm. verbum activum.

حـكـبـاـ effectio, exsecutio ; حـبـبـاـ فـرـقـاـ prosopopoeia.

حـكـبـاـ incantamentum ; it. incantator.

حـبـبـاـ efficiens, efficax ; gramm. activus.

حـبـبـاـ efficienter.

حـبـبـاـ efficax.

حـبـبـاـ , pl. حـبـبـاـ actio, operatio ; oeconomia divina ; activitas, motio, impulsus, vis ; vexatio diaboli ; it. opus, negotium ; ap. gramm., actio. نـفـسـ حـبـبـاـ مـعـ effectus est ; adv. c. كـ realiter.

حـبـبـاـ مـعـ أـحـبـاـ quod formari, effici potest ; effectus ; operationi, vi subjectus, patiens ; energumenus.

حـبـبـاـ مـعـ أـحـبـاـ formatio ; actio, vis, influxus.

حـبـبـاـ مـعـ حـبـبـاـ , مـعـ حـبـبـاـ subjectio, servitus, opera servilia ; submissio, obedientia, ditio.

حـبـبـاـ مـعـ حـبـبـاـ servorum more.

حـبـبـاـ مـعـ حـبـبـاـ subjectio.

حـبـبـاـ مـعـ حـبـبـاـ oppressor.

حـبـبـاـ مـعـ حـبـبـاـ subjectio.

حـبـبـاـ مـعـ حـبـبـاـ subjectus, dominus.

حَدَّتْهُ submissio, subjec-tio.

حَدَّلَ, fut. **حَدَّلَ** spis-sus, densus factus est ; cfr. heb. **לִבְנָה** id. et **עֲבַט** pinguem victimam mactavit.

Pa. **حَدَّلَ** id. q. Pe. ; it. spis-sum, densum reddidit.

Ethpa. **حَدَّلَ** densus factus est.

حَدَّلَمْ, pl. **حَدَّلَمْ** spissus, densus; fertilis, abundans; numerosus; subst. species herbæ salsæ et amaræ.

حَدَّلَمْ densitas, spissitas.

حَدَّلَمْ, f. pl. **حَدَّلَمْ** id. q. adj. præc. ; **حَدَّلَمْ** **حَدَّلَمْ** **بِأَوْقَمْ** urbs justitiae operibus referta; subst., ar. **غَيْرَة**, elitellæ camelii; sella muliebris dorso camelorum imposita.

حَدَّلَمْ densitas.

حَدَّلَمْ crassitudo, densitas, pinguedo; abundantia, multitudo; it. condensatio, compactio.

حَدَّلَمْ adaptatus, congruus.

حَدَّلَمْ congruentia.

حَدَّلَ, heb. **לִבְנָה**, ar. **عَبَط**, fut. **حَدَّلَ** transiit, trajecit; c.

، vel **كَ** pertransiit, iter fecit, peragravit ; c. **كَ**, nng. **حَدَّ** transgressus est, tenevit ad, divertit, accessit ; spec. c. **كَ** *urbis mænia* al-luit *flumen*; supervenit *ali-cui*; se vertit, incessit *in ali- quem*, processit hostiliter ; c. **مَ** et rarius *absol.*, recessit, effugit ; trop. præteriit *tempus*, etc. ; defecit, sedata est *ira*; *promissis* non stetit; *legem* violavit; gramm. **حَدَّ** vel **أَحَدَا** **وَدَّ** ; **حَدَّ** præteritum tempus; **حَدَّنَ** *tempus prætermisit* : tardius venit. it. omisit, prætermisit, trans-gressus est, *absol.* aut *seq.* **كَ**, nng. **كَ** vel **كَ** *rei*: **حَدَّ** **مَوْلَى** viam pertransiit, trop. terminos transgressus est, prævaricatus est ; **أَحَدَ** **كَ مَوْلَى** ne transgrediaris veritatem; it. ultro progres-sus est, superavit, c. acc. **كَ** **أَوْ** **كَ**. Part. præs. **حَدَّنَ** **أَهْوَانَ** ; **حَدَّنَ** viator. **حَدَّنَ** **كَ لَأَنْهَمْ** transgres-sor legis. **حَدَّنَ** **كَ سَعْنَ** ex-cedens in potatione vini. Part. præt. **حَدَّنَ** **كَ**; **حَدَّنَ**, **حَدَّنَ** præterierat. **مَهْنَمَا** **حَدَّنَ** **كَ** impositum tibi fuit tor-

mentum. حَتَّا حَمْدَهُ مَدْهُ su-peradulta virgo; subst. ap. gramm., præteritum.

Ethpe. حَاجَّا i trajectus est; seq. حَمْدَهُ , amotus est; prætermis-sus est, omissus est; transgressus est, deliquit. بَرْجَهُ لَاهَ حَاجَّا ad eum divertit; c. حَمْدَهُ , transiit ad; c. حَمْدَهُ , excessit in re.

Aph. حَاجَّا transire fecit; transvexit, transduxit; c. حَمْدَهُ , amovit, removit; trop. omis-sit, prætermisit; cessare fe-cit, abrogavit; c. حَمْدَهُ , vertit, intulit, transtulit; trop. ex-cessit; attribuit; it. c. حَمْدَهُ et حَمْدَهُ a lingua in aliam transtu-lit librum. حَاجَّا حَسْنَهُ مَهْنَهُ vitia tua remove a te ut crescant vir-tutes tuæ. حَاجَّا سَعْدَهُ حَمْلَهُ حَاجَّا seda iram tuam studio. حَاجَّا مَهْمَهُ dies transegit, tri-vit. حَاجَّا حَصْنَهُ حَصْنَهُ a castra di-lapidatus est. حَاجَّا festum instituit. حَاجَّا مَهْلَهُ a se removit, h.e. exuit arma.

حَاجَّا præconis voce jussit annuntiari. *Part.* حَاجَّا ; مَهْجَّا ; subst. canalis, v. in-fra.

Ettaph. حَاجَّا translatus est;

abrogatus est, transiit, tra-jectus est.

حَدَّهُ مَهْمَهُ , pl. حَدَّهُ مَهْمَهُ transgres-sio; transitio; trop. status transitorius.

حَدَّهُ حَدَّهُ , حَدَّهُ transgressio, viola-tio legis: transitus. حَفَّهُ مَهْمَهُ حَفَّهُ ۝ ۝ epis copus ille consecratus illegitime.

حَدَّهُ حَدَّهُ , al. حَدَّهُ dysenteria.

حَدَّهُ حَدَّهُ , pl. حَدَّهُ حَدَّهُ transiens, via-tor; ultra transiens, trans-gressor; f. حَدَّهُ حَدَّهُ , transito-rius, caducus; pl. حَدَّهُ حَدَّهُ مَهْمَهُ res caducæ.

حَدَّهُ حَدَّهُ مَهْمَهُ obiter.

حَدَّهُ حَدَّهُ مَهْمَهُ , pl. حَدَّهُ حَدَّهُ transitus, transgressio. حَدَّهُ مَهْمَهُ , s. pl., heb. حَدَّهُ حَدَّهُ , fru-mentum, commeatus.

حَدَّهُ حَدَّهُ , heb. حَدَّهُ حَدَّهُ , ar. حَدَّهُ حَدَّهُ , transitus, trajectus; per ex-tens. ripa, littus, regio ultra flumen sita, limes, fines; it. fretum, vadum; scapha; حَدَّهُ in parte ulteriori, trans. كَحَدَّهُ فَهُ ad regionem ultra Euphraten sitam.

حَدَّهُ حَدَّهُ familia, gens, posteri.

حَدَّهُ حَدَّهُ , f. حَدَّهُ حَدَّهُ , pl. حَدَّهُ حَدَّهُ , f. حَدَّهُ حَدَّهُ hebraeus.

حَدَّهُ حَدَّهُ hebraice.

حَدَّهُ حَدَّهُ hebraismus.

حَدَّهُ حَدَّهُ sterilis.

مَدْحُوتٌ, *emph.* مَدْحُوتاً, *pl.* مَدْحُوتاً. transitus, trajectio, excessus, locus transitūs, via; canalis, vadum, fretum; id quo transitur, scapha, *ar.* مَعْبُرٌ; *it.* agger; *trop.* modus agendi, conversatio.

مَدْهُوتٌ transire faciens, *inde* scapha, navis; locus transitūs, fretum, meatus corporis; transitorium, pars officii sacri de defunctis.

مَدْحُوتٌ pervius; **مَدْحُوتٌ** impervius; *it.* transitorius; transgressor.

مَدْحُوتٌ, *pl.* مَدْحُوتٌ. transgressio, prævaricatio.

حَمْدَةٌ et حَمْدَةٌ albo nigroque variegatum pecus; lino crudo duroque confecta vestis.

حَمْدَةٌ variegatus color.

حَمْدَةٌ - *Pu.* حَمْدَةٌ paralysi affecit. *Part. pass.* مَحْمُدٌ, *pl.*

paralyticus, claudus.

حَمْدَةٌ balbuties; stultitia.

حَمْدَةٌ et حَمْدَةٌ torpidus, iners.

حَمْدَةٌ torpedo, membrorum. torpor præ frigore, inertia.

حَمْدَةٌ rotundus fuit, usitat. tantum in deriv.; *cfr. ar.*

عَجَلَ, *et* عَرْقَلَ contorsit, *et* properavit.

حَمْدَةٌ devolvit, revolvit.

حَمْدَةٌ devolvit.

حَمْدَةٌ pass. et refl.

حَمْدَةٌ, **حَمْدَةٌ** rotundus, *heb.* גָּלֵל.

حَمْدَةٌ, *cfr. ar.* عَجَلَ festinatio; adverb. c. vel s. **حَمْدَةٌ** celeriter, cito; statim, facile.

حَمْدَةٌ quam celerrime.

حَمْدَةٌ, *heb.* גָּלֵל, *ar.* عَجَلَ, vitulus, f. حَمْدَةٌ, *vel* حَمْدَةٌ, st. c. حَمْدَةٌ; c. suff. حَمْدَةٌ, حَمْدَةٌ, *pl.* حَمْدَةٌ, حَمْدَةٌ, vitula, juvenca.

حَمْدَةٌ dim. præc.; *it.* parvus currus, dim. seq.

حَمْدَةٌ, nnq. حَمْدَةٌ plastrum, currus, *ar.* عَجَلة, *heb.* גָּלֵלה, *pl.* حَمْدَةٌ; *it.* Ursa major constellatio.

حَمْدَةٌ plastrum.

حَمْدَةٌ devolutio, complanatio.

حَمْدَةٌ volutatio; aquæ calidæ in corpus infusio.

حَمْدَةٌ complanatio.

حَمْدَةٌ volutabilis.

حَمْدَةٌ - *Part. pass.* حَمْدَةٌ taedio affectus, nausea labrans; *cfr. heb.* גָּדֵל angustatus est, *et* حَمْدَةٌ vomuit.

حَمْدَةٌ fastidium.

רָקַע, fut. רָקַעַ recubuit, jacuit, nnq. ut Pa. de-
jicit; cfr. ar. عَجَنْ baculo in-
cubuit. Part. præt. pass.
רָקַעַ, pl. רָקְעָתָא, f.
רָקְעָתָא, pl. رָקְעָתָא recumbens,
jacens, prostratus; mortuus.
Ethpe. רָקַעַ dejectus est.
Pa. רָקַעַ præcipitavit, dejicit,
protrusit.

רָקַעַ dejectio, casus; accu-
bitus.

רָקַעַ id; it. inferi, abyssus.

רָקַעַ crassus, gravis.

רָקַעַ rusticitas, feritas;
asperitas *hiemis*; densitas,
spissitudo.

רָקַעַ et רָקַעַ, pl. f. رָקַעַ crassus, rudis, rusticus; cfr.
ar. عَجَزْ crassus, spissus fuit,
cfr. etiam græc. ἄργος.

רָקַעַ crassitudo.

רָקַעַ crebro; rustice.

רָקַעַ crassitudo, feritas.

רָקַעַ helenium planta odorifera.

רָקַעַ, fut. רָקַעַ cornu
petiit.

רָקַעַ cornupeta.

רָקַעַ actus cornibus im-
tendi.

רָקַעַ, heb. רָקַעַ, particula sim-
plex vel in compos. c. aliis,
non tamen c. suff.; est:

1° præpositio: usque, usque
ad: בְּ אֶחָד מִנְבָּרָה usque ad
tempus; *sæpius* c. מֵן: בְּ מֵן et
communius גַּם מֵן; גַּם מֵן usque ad æternitatem. גַּם מֵן
usque ad occasum solis.

2° conjunctio; dum, quam-
diu, donec; וְ מִתְּמֻלָּה dum
adhuc loqueretur. בְּ אַמְתָּה quamdiu in mundo
sumus. בְּ מִתְּמֻלָּה usquedum
resurgat; c. סֵבֶב, סֵבֶב dum;
priusquam: גַּם מִתְּמֻלָּה לֹא זָהָר antequam aperiatur janua;
sed communius בְּ לֹא: בְּ מִתְּמֻלָּה antequam moriatur; in
compos. c. מֵן, dum, donec,
eousque, et tunc præfig., ver-
bo finito vel partic. בְּ מִתְּמֻלָּה donec veniat. בְּ מִתְּמֻלָּה
donec peperit filium suum. בְּ מִתְּמֻלָּה quousque?
eousque ut. בְּ מִתְּמֻלָּה quan-
diu? מִתְּמֻלָּה אֲזֶה adeo ut
etiam ille...

3° Adverbiales locutiones ef-
format: בְּ אַחֲרָה aliquandiu.
בְּ אַחֲרָה מְכֻלָּה vel בְּ מְתֻמָּה

brevi, per breve tempus. جَبْرٌ
 مَكْبُرٌ parumper, (ar. قَلِيلٌ، عَنْ قَلِيلٍ،
 فَمَا جَبْرٌ هُدْدَهْ) ; c. مَكْبُرٌ، جَبْرٌ hucus-
 que, hactenus, adeo. لَمْ جَبْرٌ
 nondum. جَبْرٌ حَدْهَهْ، et per
 contr. حَبْرٌ usque nunc.

جَبْرٌ، heb. גַּדְעָן، ar. عَذَّا، fut.
 نَجَّابٌ، incurrit ; seq. حَسْبٌ et
 saepius حَلْقٌ، invasit spiritus
 malus ; occurrit, accidit res.
 Part. præs. حَبْرٌ، حَبْرٌ .
 Ethpe. حَبْرٌ ut Ettaph.
 Aph. حَبْرٌ arripuit ; eripuit,
 vindicavit, liberavit ; adeptus
 est.

Ettaph. حَبْرٌ pass.

جَبْرٌ، ar. عَذْفٌ، fluxus, fluxus
 maris ; periodus febris.

جَبْرٌ peregrinatio, status alienigenæ.

جَبْرٌ peregrinus.

جَبْرٌ ut جَبْرٌ .

جَبْرٌ incursus, vexatio ; caligo oculorum.

جَبْرٌ، جَبْرٌ peregrinus.

جَبْرٌ peregrini status ;
 جَبْرٌ وَجَبْرٌ barbaries
 sermonis.

جَبْرٌ erceptio ; recuperatio rei.
 مَحْبُرٌ liberator.

جَبْرٌ sors.

جَهْدٌ et جَهْدٌ palumbes.
 جَهْدٌ caro vilior.

جَهْدٌ، fut. نَجَّمَهُ sarculavit,
 purgavit terram zizaniā; cfr.
 جَهْدٌ id. Part. act. حَارِثٌ، حَارِثٌ .
 Part. pass. حَبْرٌ، حَبْرٌ purgatus ; it. constrictus.
 حَارِثٌ sarculatio ; constrictio.
 حَبْرٌ constrictio.
 حَمْوِيَّةٌ sarculatio ; particula lanæ, lanugo plantarum ; villo-
 sitas vestis ; cithara, ar. عَرْدَهُ .
 حَمْوِيَّةٌ villositas panni ;
 obturamentum pilosum ad
 fissuras obturandas.
 حَمْوِيَّةٌ etc., v. s. حَمْوِيَّةٌ .

جَهْدٌ، ar. عَذْلٌ، fut. حَبْرٌ
 culpavit, objurgavit, criminatus est, c. acc. rei et حَلْقٌ pers.
 Part. pass. حَبْرٌ، حَبْرٌ ;
 حَبْرٌ وَحَبْرٌ inculpatus, innocens.

Ethpe. حَلْقٌ pass.

Pa. حَلْقٌ graviter culpavit.

Ethpa. حَلْقٌ id. q. Peal.

Aph. حَلْقٌ reprehendit.

Parel حَلْقٌ id.

جَهْدٌ، جَهْدٌ reprehensio, accusatio, crimen ; res culpanda.

جَهْدٌ accusator.

جَهْدٌ culpabiliter ; præc. حَلْقٌ ،
 innocenter.

جِهَمَّةٌ reprehensibilitas, culpabilitas.

جِهَمَّةٌ vituperabilis, culpabilis.
جِهَمَّةٌ objurgatio.

جِهَمَّةٌ reprehensio, culpa.

جِهَمَّةٌ reprehensio, culpatio.
جِهَمَّةٌ , f. جِهَمَّةٌ reprehensibilis ; obtrectator.

جِهَمَّةٌ , vox ar. تَنْدِيلٍ , exactio capitum (gall. capitation) ; tributum.

جِهَنَّمٌ et جِهَنَّمٌ , heb. גַּהְןָם , Eden, Paradisus terrestris.

Pa. جِهَنَّمٌ v. denom., deliciis oblectavit, amoenum reddidit.

Part. pass. جِهَنَّمٌ , emph. جِهَنَّمٌ , f. emph. جِهَنَّمٌ , deliciis affluens, fertilis ; molliter educatus ; plenus, refertus.

Ethpa. جِهَنَّمٌ deliciis indulxit, fruitus est ; fertilis fuit locus.

Part. in جِهَنَّمٌ deliciis fruens et جِهَنَّمٌ Edeno similis, paradisiacus.

جِهَنَّمَةٌ deliciæ.
جِهَنَّمَةٌ luxus, mollities ; deliciæ.

جِهَنَّمٌ , cfr. ar. عِدَانٌ , et heb. יְמֵדָה , pl. جِهَنَّمَاتٌ et tempus, epocha ; annus, vi-
ces, anni tempora ; occasio ; جِهَنَّمَاتٌ quinquies.

جِهَنَّمٌ eo ipso tempore.

جِهَنَّمٌ , non in suo tempore : ante tempus; adject. c. , temporarius : ira momentanea ; adverb. جِهَنَّمٌ , pro tempore, jam. id.

جِهَنَّمٌ vel حَكْلَجَنْتَمٌ semper.

جِهَنَّمٌ vel حَبْسَتَمٌ , it.

جِهَنَّمٌ et حَبْتَمٌ aliquando, aliquoties, interdum.

جِهَنَّمٌ حَكْبَرْنَمٌ per integrum annum,

جِهَنَّمٌ اَحَدَهُ حَكْبَرْنَمٌ post annos.

ad breve. جِهَنَّمٌ مَّعْنَمٌ diu.

جِهَنَّمٌ فَلْنَمٌ وَكَلْمٌ sub mediam noctem. جِهَنَّمٌ مَّعْنَمٌ sub diluculo.

جِهَنَّمٌ اَمْسَهُنْمٌ ut in

tempore, ut olim.

جِهَنَّمٌ وَنَفْتَمٌ tempore quo egrediuntur.

جِهَنَّمٌ opportunus.

جِهَنَّمٌ , inus. ; cfr. ar. عَدْقٌ collegit, et عَدْقٌ abundans fuit fons. Part. pass. جِهَنَّمٌ exuberans, plenus.

جِهَنَّمٌ , emph. جِهَنَّمٌ , cincinnus ; fimbria ; racemus, ar. عَنْقٌ

Pa. جِهَنَّمٌ den., cæsariem mundavit.

جِهَنَّمٌ , fut. نُجَاهَنَّمٌ adjuvit. opem tulit, sustentavit. c. **و** pers. : it. profuit res : cfr.

ur. عَذْرٌ excusatione defendit
aliquem, *it.* أَذْرَ et عَزْرٌ opitulatus est. *Part. act.* حَبْرٌ,
f. حَبْرًا, *pl.* حَبْرًا fulcrum; malus
navis vel trabs transversa na-
vis cui suspenduntur vela,
antennae. Part. pass. حَبْرٌ
أَذْرَ.

Pa. ةَبْعَدْ بُكْرٌ opitulatus est, adjuvit, defendit, *c. acc. pers. vel* ﴿،*nng.*﴾ ةَبْعَدْ ; profuit res ; *seq.* ﴿كَمْهَدْ﴾ ةَبْعَدْ impugnavit.
Part. لَا مَدْبُوا ; مَدْبُوا ، مَدْبُوا
 inutilis. مَعْكُو كَعْكَبْ قَوْقَلْ
 ad ei opem ferendum ascendi.

*Ethpa. ئەنلىٰ pass. ; utilitatem
percepit ; convaluit. ئەنلىٰ
valeas ! salvus sis !*

جُنْدًا, *pl.* **جُنَادًا** auxilium; utilitas;
in pl. fulerum, sustentacu-
 lum; auxiliares copiae. **جُنَادِي**
 auxiliator.

جَهْدُهُمْ ، جَهْدُهُمْ adjutorium ;
auxilium, utilitas ; benefi-
cium, bona ; sanatio. قَلْمَانْ
جَهْدُهُمْ وَجَهْدُهُمْ cantus
ad suffragandum animabus
defunctis.

auxiliator, adjutor.

saponaria officinalis
planta, ptarmica.

مدْجُونٌ, **مدْجُونَةٌ** adjutor; defensor, fautor; utilis.

مَدْجُودٌ وَنَمَاء مَدْجُودٌ وَنَمَاء auxiliaris.
مَدْجُودٌ وَنَمَاء مَدْجُودٌ وَنَمَاء adjuvan-
 dus.

أَعْجُمٌ adjumenti receptio.
أَعْجَمٌ auxilium; optio miles,
(gall. adjudant).

أَجْوَادُ adjutorium, auxilium.
أَلْحَانٌ et deriv., v. rad. $\omega\alpha$.

؟٤٢ (vel ۹۰۷ pronuntiata
ap. Syros occid. littera ۸ uti
l, flexoque præterito, etiam
præc. procliticis. ۸۰۲, ad
instar verbi per l incipientis,
inde nnq. scribitur ۹۰۱),
fut. ۹۰۳, imper. ۹۰۴,
c. suff. ۹۰۵, ap. Nestor.
۹۰۶, meminit, recordatus
est; commemoravit. ۹۰۷
۹۰۸ ad se rediit; cfr. ar.
۹۰۹ pactum init; cognovit.
Part. act. ۹۰۱, ۹۰۲ memor;
in memoriam revocans, com-
memorans. Part. pass. ۹۰۱,
۹۰۲, f. emph. ۹۰۳, com-
memoratus.

Ethpe. ፩፻፭፻ vel ፩፻፭፻ id. q.
Peal; c. suff. ፩፻፭፻ tui me-
mor fui; it. animo vertit rem;
pass. commemoratus est;

mentio facta est اَمْحَدَةٌ مَذَكُورٌ
لِّمَذَّالِي، memorata laus.

Pa. حَفَّ memorare reddidit,
c. acc. pers. et rei; commemo-
ratavit.

Ethpa. مَذَّالِي memoratus est.

Part. مَهْمَدٌ memor.

Aph. حَادِي commemoravit,
mentionem fecit, memoriæ
prodidit; memorem esse fe-
cit, admonuit.

جَهْمَوْنَى، حَادِي وَرَبْرَبَةٌ، vel حَادِي وَرَبْرَبَةٌ, nnq.
pl. حَادِي وَرَبْرَبَةٌ memoria,
recordatio; imago in memoria
impressa; mentio, commemo-
ratio; monumenta *vel* acta
memoranda; memoriale, com-
mentarius; catalogus. حَادِي
وَرَبْرَبَةٌ liber actorum
præteriorum et memorabi-
lium.

حَادِي وَرَبْرَبَةٌ، حَادِي وَرَبْرَبَةٌ vir felicis re-
cordationis.

مَهْمَدٌ, حَادِي memor.

اَمْحَدَةٌ مَذَكُورٌ commemora-
tor; historiographus; cancel-
larius.

اَمْحَدَةٌ مَذَكُورٌ commemo-
ratio; commonitio; com-
mentarius.

اَمْحَدَةٌ مَذَكُورٌ, pl. حَادِي وَرَبْرَبَةٌ
memorabilis, memor.

اَمْحَدَةٌ مَذَكُورٌ وَتَعَالَى vel اَمْحَدَةٌ مَذَكُورٌ وَتَعَالَى ;
pl. مَذَكُورٌ وَتَعَالَى memoria,
commemoratio; commenta-
rius. اَمْحَدَةٌ مَذَكُورٌ وَتَعَالَى memoriam
defectus.

حَادِي (vel حَادِي cum ead.
script. in Peal et in deriv. ac
وَرَبْرَبَةٌ), exstat tantum in Part.
حَادِي, تَعَالَى conveniens, con-
gruus, aptus; pl. تَعَالَى et
حَادِي وَتَعَالَى, f. emph. حَادِي
commoda. حَادِي وَرَبْرَبَةٌ tempus
opportunum.

اَمْحَدَةٌ opportunitas.
اَمْحَدَةٌ congrue, apte.
اَمْحَدَةٌ congruentia, aptitudo,
propensio; opportunitas; oc-
casio; c. præc. وَ, inconve-
nientia.

تَعَالَى conveniens, aptus.

حَادِي (vel حَادِي, c. ead.
script. ac verba præc.), ar.
عَيْرَ, fut. وَهَذِهُ lascivus fuit,
libidini indulxit: insanuit.
Part. præs. حَادِي, حَادِي .
Part. præt. مَهْمَدٌ, حَادِي, nnq.
حَادِي lascivus.

Ethpa. حَادِي id. q. Peal.
اَمْحَدَةٌ libido, lascivia.

دَهْمَدَةٌ impudicus, libidino-
sus.

حَدَّ et جَمْ جَمْ، ar. عَوَى، fut.

نُحْمَا ululavit, gemitus, clamores edidit. Part. præs.
جَهْمَا، نُحْمَا.

Pa. حَدَّ ululavit.

Aph. أَحَمَّهُ gemere fecit.

حَمْ حَمْ et ١٠٠ حَمْ ululatus, gemitus.
حَمْ gemitus, luctus; it.
pannus, cfr. حَمْ .

حَمْ ululatus, gemitus.

حَمْ gemitus; latratus.

حَمْ ululans, latrator.

حَدَّ inus. in Pe.; cfr. ar.

عَبَ macula, vitio infectus est,
et غَابَ latuit.

Pa. حَتَّ irritis, ar. عَيْبَ vitio
insimulavit. Part. act. مَحَّتَ subsannans; occultans, ar.
غَيْبَ . Part. pass. مَحَّتَ; nubilosus.

Ethpe. حَدَّا obnubilatus est.

Aph. أَحَدَّ obscuravit, occultavit; cfr. heb. הַשְׁרֵב (Hiph. v.
imus. شَرَب) id.

حَدَّا، et emph. حَدَّا، ar.
غَبَّة، heb. כָּעַ، silva opaca;
وَسَ حَدَّا salictum; حَدَّا حَدَّا illex arbor.

حَدَّا sinus, v. s. حَدَّ .

حَمْحَمَ occultatio.

حَمْحَمَ sacculus, cfr. ar. جِنْبَ

it. sarcophagus, cfr. غَيَّبَ se-pulcrum; nebula, cfr. حَمْ حَمْ obnubilatio.

حَمْ، fut. حَمْ sarculavit, v. بَعْدَ ;
it. cfr. ar. سَرَقَ rediit.

Pa. حَمْ، ar. عَوَّذَ, assuefecit;
mansuefecit. حَمْ حَمْ لَمْ يَأْتِ إِلَيْهِ ad ferendum
onus Domini collum ejus
non assuefecit. Part. pass.
مَحْبَّا، مَحْبَّا consuetus, solitus;
exercitatus, versatus;
impers. solet.

Ethpa. حَمْ حَمْ pass. consuevit;
it. cicuratum est animal.

Aph. أَحَبَ assuevit. Part. act.
مَحْبَّا، مَحْبَّا assuetus; مَحْبَّا حَمْ حَمْ حَمْ حَمْ assuetus
erat ad contemptum legis.
Part. pass. مَحْبَّا، مَحْبَّا assue-tus, solitus; familiaris, c. دَهْ;
أَوْ مَحْبَّا وَمَحْبَّا vel
أَمْ وَمَحْبَّا ut soles, ut
tibi mos est. أَوْ مَحْبَّا وَمَحْبَّا uti consueverat.

حَمْ حَمْ، pl. حَمْ حَمْ حَمْ حَمْ consuetudo,
mos; ritus, cærenomia; situs
loci; mores, oratoriis mores,
passiones; it. sarculatio, v. بَعْدَ .

حَمْ حَمْ مَهْ مَهْ مَهْ وَحَمْ حَمْ حَمْ حَمْ solita adhorta-tio.
أَلْ حَمْ حَمْ vel أَلْ حَمْ حَمْ، insueta
حَمْ حَمْ مَهْ مَهْ مَهْ وَحَمْ حَمْ حَمْ حَمْ res. حَمْ حَمْ مَهْ مَهْ مَهْ وَحَمْ حَمْ حَمْ beni-

gnior est quam de solito.
حَبْرًا secundum consuetudinem, pro more. **حَبْرًا** pro more suo **مِنْ حَبْرًا** ex consuetudine. **مِنْ وَحْبًا** praeter consuetudinem. **مِنْ حَبْرًا أَمْ** **وَحْبًا** id moris erat ut...
وَحْبًا id consuetudinis habebat ut... **مَحْبَّمْ بَمْ** **مَهْبَّمْ** **كَهْ** eum colere consueverant.

حَبْرَنَامَة ex more.

حَبْرَنَامَا moralis (*id. q. θιμωνός*).
حَبْرَنَامَا consuetus, solitus; familiaris; ethicus; *it. ut حَبْرَنَامَا*.
حَبْرُ, *particula proclitica, heb.*
شَدَّ, *ar. عَزَّذَا*, adhuc, iterum; scilicet, nempe.
حَمْدَهُ, *c.*, noctua *avis* ; floccus lanæ ; aloes, *ar. عُود* .
مَهْبَّهَمَا assuefactio, consuetudo.
مَهْبَّهَمَا, *f.*, **مَهْبَّهَمَاتَا**, *f. pl.*
مَهْبَّهَمَاتَا consuetudinem generans *res*.

حَلَّ, *(a rad. inus. مَجَّ)*, **حَلَّا**, *(a rad. inus. مَجَّ)*, **حَلَّا**, *(a rad. inus. مَجَّ)*, **حَلَّا**, *tempus condixit, congregavit), festum, ar. عَيْدٌ id.; cfr. heb. מַרְגֵּז et ar. مِيعَاد, convenitus, locus ad conveniendum constitutus. حَلَّ حَلَّا وَضَهَرَ* sua natalicia celebravit.

حَلَّوْنَامَة festive.

حَلَّوْنَامَا celebratio festivitatis.

حَلَّوْنَامَا festivus, feriatus, ad festa pertinens.

حَلَّوْنَامَا *et جَهْبَا* festum; celebratio festi.

حَلَّوْنَامَهُ, *v. denom.*, festum celebravit.

Ethpalp. *جَهْ* *أَجَّمَ* *pass.*

حَمَّانَهُ, *heb. שָׁדָה*, *a rad.* **שָׁדָה**, *cfr.*

وَعَدْ *et جَهْ*, *st. c.* **لَهْبَامَهُ**, *c. suff.*

لَهْبَامَهُ, *vel لَهْبَامَهُ*, *pl.*

لَهْبَامَهُ, ecclesia, coetus; templum. **جَهْلَامَهُ** **وَهَدَهُ** cathedralis ecclesia.

لَهْبَامَهُ *v. denom.*, coadunavit.

لَهْبَامَهُ *dim.*, parva ecclesia, sacellum.

لَهْبَامَهُ ecclesiastice; *jure positivo* ecclesiastico.

لَهْبَامَهُ ecclesiasticus.

لَهْبَامَهُ scientia sacra; *jus ecclesiae*.

لَهْبَامَهُ *et جَهْلَامَهُ* festorum celebratio.

لَهْبَامَهُ qui festum celebrat; ad festum pertinens.

لَهْبَامَهُ, *fut.* **لَهْبَامَهُ**, *id. q. لَهْبَامَهُ*, invaluit.

لَهْبَامَهُ fortitudo.

لَهْبَامَهُ robur, *v. s.* **لَهْبَامَهُ**.

حَمْلٌ himnulus, v. s. حَمْلٌ .
حَمْلَةٌ spina.

حَلَّ *vix usit. in Pe. ; cfr. ar. حَلَّ exacerbavit, ad iram provocavit.*

Pa. حَلَّ exacerbavit ; al. form. Pa. حَلَّ, iratus est.

Ethpa. حَلَّاً iratus est. حَلَّ, ar. غَيْظٌ, ira, indignatio ; contumelia. بَهَّ et مَهَّ iram continuit.

حَمَّ, *ar. حَمَّاً, حَمَّاً* indignationem movens, irritans.

حَمْرَدٌ *ar. عُطَارِدٌ Mercurius plana.*

حَنَّ *inus. ; cfr. ar. عَنْ retinuit.*

Pa. حَنَّ impedivit, coercuit, prohibuit.

Ethpa. حَنَّاً pass. Part. حَنَّاً , حَنَّاً ; لَا حَمَّادًا non impeditur : nihil refert.

حَهْفَأٌ *impedimentum, obstaculum.*

حَهْفَأٌ *impeditor, obstans ; حَهْفَأٌ وَهَنْأٌ perturbatores pacis ; pl. f. حَهْفَأٌ impe- dimenta, obstacula.*

حَهْفَأٌ *impeditoris more.*

حَهْفَأٌ *qui impediri, coerceri potest.*

حَمْكَهْدَنْهَمْ cum impedimento. حَمْكَهْدَنْهَمْ impeditio.

حَلَّ *inus. ; cfr. ar. حَلَّ , dolo aggressus est, inique egit, et בָּל (Pi. v. inus. בָּל) id.*

Pa. حَلَّ, deliquit.

Ethpa. حَلَّاً inique tractatus est.

Aph. حَلَّاً inique egit ; inique tractavit, c. حَلَّ , in scelus induxit.

حَمَّ, *heb. בָּל , nequitia, ini- quitas ; scelus ; c. حَلَّ , inique.*

حَمَّلٌ, *pl. حَمَّلٌ pravus, iniquus, impius.*

حَمَّلَهْلَمْ inique.

حَمَّكَهْمَلْهَمْ et حَمَّكَهْمَلْهَمْ iniquitas, improbitas.

حَمَّكَهْكَهْكَهْ inique agens, facinorosus.

حَمَّكَهْكَهْكَهْ inique tractatus, injuria affectus.

حَمَّكَهْكَهْكَهْ injuria.

حَلَّ *inus. ; cfr. ar. عَلَى et heb. צָלָل , nutritivit. Part. pass.*

حَلَّ nutritus, inde semper subst. usurpat., pullus, chald. אֲלָל, pullus equæ, etc., pl. حَلَّ.

حَلَّ, *heb. צָלָل , infans, lactens, puer ; foetus ; trop. fructus.*

حَلَّكَهْلَمْ, *pl. حَلَّكَهْلَمْ infantia ;*

status embryonis; *it.*, *v. s.*
حَوْ .

pullus, *v. supra*.
حَوْ مُعَاكِهٌ vox pers., vestimenti genus.

حُمْ inus.; *cfr. ar.* غَمْ nubilosum fuit *cælum*.

Ethpa. اَحْسَنَ obnubilatus est; obscuratus est.

Ethpailal اَحْسَنَ id.

Aph. اَحْسَنَ obscuravit.

حَفْ , *ar.* غَيْرٌ, nebula; *trop.* velum calicis.

حَسْدٌ , حَسْدٌ obscurus.

حَمْ vagivit *infans*.

حَمْ vagitus.

حُكْ , *cfr. حَكْ et ar.* ضَعَفَ ; fut. نَهَى , duplicavit; *it.* pli- cavit; involvit, obtexit; in duplum factus est, *inde* divi- sit, extraxit, *et trop.* immi- nutus est viribus, elanguit, defecit, *cfr. heb.* שָׁבֵךְ , *et* שָׁבֵךְ et ضَعَفَ debilis fuit; *cfr. etiam حُكْ et حَفْ . Part. pass.*

حَفْ plicatus; *inde c. 1 prosthet.*, اَحْفَ , dupli- catus, duplex. حَمْكَهٌ حَافَتْ triplicando; *f. emph. et subst.*

اَحْمَدَهَا conclave interius,

quadratus locus; spelunca duplex ab Abraham mercata in Hebron.

Pa. حُكْ debilitavit.

Ethpa. اَحْنَفْ debilis factus est, in deliquium incidit; do- luit; fractus est.

Aph. اَحْنَفْ debilitavit.

حَفْ pro اَحْفَ duplum.

حَامِقَهٌ iteratio; deliquium animi.

حَفْ plicatio; deliquium animi; juba, galli crista.

حَفْ duplicatio; juba jumen- ti.

حَسْخَهٌ , حَسْخَهٌ lassus, deficiens viribus; plicatus.

حَفْلَهٌ vel اَحْفَلَهٌ dupliciter.

حَسْفَهٌ defatigatio.

حَمْكَهٌ deliquium animi.

حَمْ , heb. שַׁחַד , collect. aves; per extens. apes; ramus, ver- tex ramorum; *cfr. ar.* عَافَ gyravit avis. حَمْكَهٌ , pl. حَمْكَهٌ pullus avium. حَمْفَهٌ absinthii plan- ta.

حَرْ , fut. شَعَرْ , coarc- tavit, conjunxit, *cfr. ar.* عَوْصَنْ constrictus est, intricatus fuit.

حُرْ coaretatio, angustia.

لُوْجَرٌ coaretatio, conjunctio ; angustiae.

لُوْجَرٌ sonitus strangulatus, inde vagitus, ululatus.

Pa. لُفَرٌ v. denom., vagivit. infans ; it. ululavit, cfr. حُمَّةٌ.

حُمَّةٌ, heb. حُمَّة, ar. ضَاقَ, fut. ضَاقَهُ abhorruit, c. حَمَّا vel حَمَّا rei, coarctatus est, angore cruciatus est; حُمَّةٌ حُمَّةٌ abhorruit anima nostra a pane ; inde, subaud. حُمَّا, impers.: حُمَّةٌ حُمَّا abhorrui, in angore fui; me tædet.

لَا حَمَّا اَخْمَدَ حَمَّةٌ ne defatigeris nimium legendo.

Part. præs. حُمَّا.

Part. præt. حُمَّا coaretatus, pro quo usitatetur حُمَّا q. vid. infra.

Ethpe. حُمَّا coarctatus est ; contristatus est, doluit ; iratus est ; **impers.** حُمَّا vel حُمَّا contristatus est.

Pa. حُمَّا angore affecit.

Ethpa. حُمَّا angore, tædio affectus est.

Aph. حُمَّا compressit, coartavit, obsedit ; angore affecit, afflixit, vexavit.

لَا حَمَّا وَلَا آخْبَرَ حَمَّةٌ noli exprimere pomum ne amittat

suum saporem. **Part. act.** حُمَّةٌ مَحْمَّدا contristans; **nnq.**

فِي أَسْنَا وَمَحْمَّدا pass., afflictus. حُمَّةٌ مَهْمَّةٌ a quo contristatus eram, salutem habui.

Part. pass. مَحْمَّدا مَهْمَّةٌ afflictus.

حُمَّةٌ denom. a part. præc., afflictus est.

حُمَّا, emph. حُمَّا, st. c. حُمَّا, c. suff. 1st pers. حُمَّا, pl.

حُمَّةٌ حُمَّةٌ angor, tristitia ; damnum. حُمَّةٌ حُمَّا حُمَّا cum omnimodo cruciatiu. حُمَّا variæ angustiæ.

حُمَّةٌ حُمَّةٌ angustiatus, afflictus ; impers. حُمَّا لَوْتٍ كَ dolui.

حُمَّةٌ حُمَّةٌ cum angore.

حُمَّةٌ حُمَّةٌ angor animi, tristitia.

حُمَّةٌ حُمَّةٌ molestus ; moestus.

حُمَّةٌ حُمَّةٌ moleste.

حُمَّةٌ حُمَّةٌ moeste.

حُمَّةٌ حُمَّةٌ molestia, oppressio.

حُمَّةٌ حُمَّةٌ mus, v. s.

حُمَّةٌ, fut. حُمَّةٌ, cæcus fuit, vix usitat. præter. **Part.** حُمَّةٌ, heb. حُمَّةٌ, cæ-

cus ; *trop.* impervius ; *it.* monocular, *ar.* أَغْوَرُ *a* luscus fuit. حَمَّةٌ حَمَّةٌ judicio obcæcati.

Pa. حَمَّةٌ excæcavit. *Part.* pass. حَمَّةٌ, حَمَّةٌ cæcus ; *pl. f.* حَمَّةٌ cæcæ.

Ethpa. حَمَّةٌ luscus, cæcus fuit, obcæcatus est.

Aph. حَمَّةٌ excæcavit.

حَمَّةٌ lusci status, cæcitas.

حَمَّةٌ cæco modo.

حَمَّةٌ cæcitas ; obcæcatio mentalis.

حَمَّةٌ, *ar.* عُوَارٌ, id quod oculum laedit, *inde* palea, atomus, pulvisculus.

حَمَّةٌ, *v. s.* حَمَّةٌ.

حَمَّةٌ, *heb.* צַדְקָה, *fut.* vigilavit, vix usit. *præter Part.*; *cfr. ar.* غَارٌ zelo animatus est.

Part. præs. حَمَّةٌ, حَمَّةٌ vigilans. *Part. præt.* حَمَّةٌ, حَمَّةٌ, *nng.* حَمَّةٌ vigil, experrectus ; *trop.* intentus, alacer ; حَمَّةٌ semisomnis ; بَعْدًا حَمَّةٌ scientia vigilans : rebus studens et attendens ; *subst.* حَمَّةٌ, *pl.* حَمَّةٌ angelus, *heb.* שֶׁרֶץ.

Ethpe. حَمَّةٌ experrectus est ; *trop.* motus est; se excitavit, surrexit ad opus contra hos-

tem; *c.* حَمَّةٌ *rei*, incepit, rem aggressus est.

Pa. حَمَّةٌ ut Aph.

Aph. حَمَّةٌ expergefecit, e somno excitavit; incitavit. *Part.* حَمَّةٌ, حَمَّةٌ expergefaciens ; *it.* e somno expergefactus.

حَمَّةٌ, *emph.* حَمَّةٌ, vindicta ; *it.* æmulus, æmula : *cfr.* حَمَّةٌ s. حَمَّةٌ.

حَمَّةٌ vigilarer.

حَمَّةٌ asphodelus herba ; viscus sutorum.

حَمَّةٌ vigilia, expergefactio, excitatio ; vigilantia.

حَمَّةٌ ad vigiliam pertinens.

حَمَّةٌ angelicus.

حَمَّةٌ, حَمَّةٌ excitator ; rutabulum. حَمَّةٌ, حَمَّةٌ invitatorium, pars Officij Nocturni.

حَمَّةٌ, *pl.* حَمَّةٌ excitatio e somno ; incitatio, monitio, monitum.

حَمَّةٌ experrectus.

حَمَّةٌ experrectio.

حَمَّةٌ et حَمَّةٌ, *v. s.* حَمَّةٌ.

حَمَّةٌ jocus, scurrilitas ; *it. ut seq.*

حَمَّةٌ palus, cœnum ; *cfr. ar.* غَاصٌ, depressa sunt aqua et palus.

حَدَّا *vel* حَدَّ *inus.* *cfr.* *ar.*

عَزِيْ بatiens fuit.

Pa. حَدَّ fortē se præbuit, au-sus est, prævaluit, *c.* حَدَّ; restitit, perstitit, mansit; *it.* ursit, roboravit, ad fortitudinem impulit. أَمْ حُسْنٌ وَاحِدًا؟ حَدَّا num resistere vales?

Ethpa. حَدَّا fortē se præbuit.

حَدَّا patientia, constantia, fortitudo.

حَدَّا et حَدَّا id.

حَدَّا fortiter, constanter.

حَدَّ, heb. حَدَّ, ar. عَزَّ, fut. حَدَّ, invaluit, vehemens fuit; prævaluit, *c.* حَدَّ. *Part. præs.* حَدَّا, حَدَّا; *adject. f. emph.* حَدَّا ferax terra.

Pa. حَدَّ fortiter restitit.

Ethpa. حَدَّا ut *Peal*; *seq.* حَدَّا vel infremuit spiritu; حَدَّا vel حَدَّا ira aestuavit.

حَدَّا vis, vehementia, impetus, aestus; *seq.* حَدَّا flos aetatis.

حَدَّا vis, aestus.

حَدَّa, *a forma* حَدَّ, fortitudo.

حَدَّا, حَدَّا fortis, vehemens,

terribilis; *oculos* perstringens lumen; acer fructus.

حَدَّا vehementer, fortiter.

حَدَّا vehementia, fortitudo; asperitas fructus; vis, aestus. حَدَّا, *pro* حَدَّا, *v. s.* حَدَّا.

حَدَّا, *ar.* عَزَّ, *fut.* حَدَّا, nevit; implicavit, *cfr.* حَدَّا, *s.* حَدَّا. *Part. pass.* حَدَّا, حَدَّا; *trop.* conjunctus, compo-situs, contextus.

Parel حَدَّا implicavit, complicavit, innexuit; composuit, univit. *Part.* حَدَّا contextus; perplexus.

Ethparel حَدَّا pass. et refl.; *it.* matrimonio se junxit.

حَدَّا et حَدَّا netus; tela.

حَدَّا filum.

حَدَّا, حَدَّا textor.

حَدَّا porcus.

حَدَّا actus nendi, textura.

حَدَّا, pl. حَدَّا implicatio, conjunctio; *verbum* intricatum, unde ænigma; *trop.* curæ.

حَدَّا tugurium ex ramis intertextis confectum.

حَدَّا ad instar tugurii con-textum.

غَرَبَةً, حَدَّا, st. est. حَدَّا, ar. غَرَبَةً, حَدَّا dim. v. غَرَبَةً, pullus dorcadis.

جاء مُهَدِّلٌ et مُهَدِّلٌ fusus ; discus pauperum mendicantium.

مُهَدِّلٌ orbiculus fusi.

مُهَدِّلٌ , ar. مَغْزِلٌ , fusus.

مُهَدِّلٌ et مُهَدِّلٌ implicatio ; verba intricata.

مُهَدِّلٌ status rei intricatae.

جاء , fut. تُهْدِي conflavit, purgavit aurum.

جَاهْدُونْ , جَاهْدُونْ asper, hispidus ; raucus.

جَاهْدُونْ asperitas, duritas ; raucitas.

جَاهْدُونْ et جَاهْدُونْ , chald. אַקְוֹן , pl. جَاهْدُونْ annulus, sigillum ; podex. جَاهْدُونْ وَجَاهْدُونْ cincinni. جَاهْدُونْ وَجَاهْدُونْ custos sigilli.

جاء , heb. צָבֵא , ar. جَاهْدَنْ , usitat. in Part. pass. جَاهْدَنْ involutus.

Palal جَاهْدَنْ involvit ; fasciis involvit.

Ethpalal جَاهْدَنْ pass.

جَاهْدُونْ pessulus.

جَاهْدَنْ sarcocolla, species arboreis resinaceae.

جَاهْدَنْ , pl. جَاهْدَنْ et جَاهْدَنْ fasciae ; panni.

جَاهْدَنْ mespilus ; sorbus fructus.

جَاهْدَنْ ætas nubilis, puella nubilis; it. hypomelis arbor, mespilus, sorbus, cfr. أحْدَنْ , ar. زَعْزَرَر.

جاء , heb. תִּהְדֹּי , cfr. ar. غَطَى , operuit, fut. تَهْدِي delebit, perdidit, destruxit ; pecatum condonavit ; removit, abstulit librum e monasterio. Part. act. جَاهْدَنْ – Part. pass. تَهْدِي , تَهْدِي دَهْدِيْنْ ; delendæ seu execrandæ memoriae homo.

Ethpe. جَاهْدَنْ deletus est, extermatus est.

Pa. تَهْدِي penitus delevit.

Ethpa. جَاهْدَنْ pass.

Aph. جَاهْدَنْ delere fecit.

جَاهْدَنْ et جَاهْدَنْ جَاهْدَنْ deletio ; negatio.

جَاهْدَنْ id.

جَاهْدَنْ delector, obliterator.

جَاهْدَنْ delendus.

جَاهْدَنْ deletio.

جَاهْدَنْ herba ex qua corbes texuntur.

جاء , fut. تَهْدِي stupidus fuit, desipuit cfr. ar. عَطَلٌ otiosus, piger. fuit et نَفِيْهُ (Niph. v. نَفِيْهُ , inus.) تَهْدِي تَهْدِي obduratum habuit auditum.

Ethpa. ظَاهِرٌ impeditus est, angustiatus est.

ظَاهِرٌ, جَهْلٌ, pl. ظَاهِرٌ, f. ظَاهِرٌ difficultis, gravis; tardus *mente, lingua*; stupidus. ظَاهِرٌ ظَاهِرٌ tardus est ad audiendas preces meas. ظَاهِرٌ ægre.

ظَاهِرٌ difficultas, tarditas, gravitas; balbuties; duritas, obstinatio.

ظَاهِرٌ f., emph. ظَاهِرٌ, pl. ظَاهِرٌ femur, cfr. ar. ظَاهِرٌ os; trop. latus montis; ramus.

ظَاهِرٌ, fut. ظَاهِرٌ, reversus est, cfr. ar. ظَاهِرٌ vertit; se vertit, reflexit; seq. al. verbo pler. æquivalet adverb.: iterum, rursus; ظَاهِرٌ ظَاهِرٌ iterum ascendit; it. induit *vestes*; nng. ut Aph. reddit; gramm., unitus est alii verbo per conjunctionem. ظَاهِرٌ ظَاهِرٌ carnem induit h. e. assumpsit. Part. pass. ظَاهِرٌ, ظَاهِرٌ; *baptismo ornatus*. ظَاهِرٌ ظَاهِرٌ radiis indutus: splendore ornatus. ظَاهِرٌ ظَاهِرٌ amicti victoria; victores. ظَاهِرٌ ظَاهِرٌ magnificentia vestitus es; impers. ظَاهِرٌ ظَاهِرٌ non sum reversus; subst. v. infra.

Ethpe. ظَاهِرٌ pass.; tectus est; reversus est.

Pa. ظَاهِرٌ vestivit, operuit; involvit; circumdedit. Part. ظَاهِرٌ ظَاهِرٌ: مَدْهُفٌ بَحْرًا: مدْهُفٌ byssō ornata; subst. v. *infra*.

Ethpa. ظَاهِرٌ pass.; se involvit, se vestivit, induit, c. acc. *rei*; cfr. heb. נִזְבֵּן et ar. نَزَّبَنْتَ; ظَاهِرٌ, it. etiam ap. Nest. ظَاهِرٌ induas te; trop. sibi assumpsit *nomen*. ظَاهِرٌ ظَاهِرٌ مَهْمَةٌ verba inania in labiis volverunt.

Aph. ظَاهِرٌ revertere fecit, revocavit, reddidit; respondit; it. ut *Pa.* induit. Part. pass. ظَاهِرٌ indutus, redux; subst. amictus.

ظَاهِرٌ reversio, retrogradatio; pallium, ar. ظَاهِرٌ.

ظَاهِرٌ vestitus, involutio; pallium; it. reditus, reversio.

ظَاهِرٌ reditus, circuitus, fluxus fluminis; gramm., adjunctio vocis ad alteram, ar. ظَاهِرٌ ظَاهِرٌ particula conjungens: conjunctio.

ظَاهِرٌ revertens; gramm., se adjungens vox.

ظَاهِرٌ, gramm., copulatus, particula copulans.

حَمْفَعًا	reversio ; pallium du-	دَهْوَةً	fumosus.
حَمْفَعًا	pallium duplicatum ;	حَمْفَع	عَطَسَ
	indumentum.		sternutavit.
حَمْفُقًا	indutio ; vestitus.	حَمْفَعًا	sternutamentum.
حَمْفُقًا	indutio.	حَمْفَعًا	, emph. pl.
حَمْفَعًا	, gramm., adjunctus,	حَمْفَعًا	sternutamentum, ar.
	(ar. المَعْطُوفُ).		عَطَسَ et عَطَسَةً , heb. נִשְׁרֵשׁה .
حَمْفَع	, ar. حَمَرَ , heb. עַטְרָה , fut. نَحْمَنَ	حَمْفَعًا	sternutatorius ; ptarmica planta.
	emisit fumum, af-	حَمَنَا	con-
	flavit odorem abs. vel seq.	تَمَنَّا	tempsit ;
حَمْفَعًا	; trop. flagravit	مَنَعَ حَمَنَّا	despectui fuit, in contemptum
حَمْفَعًا	studio. Part. pass. حَمَنَّا	فِي حَمَنَّا	venit. مَلَأَ أَمْبَوَيْبَ حَمَنَّا ploratu manus implevit : querelis in-
	fœtida aqua.		dulsit.
Pa. حَمَنَّا	suffivit.	حَمْنَا	et deriv., v. s. حَمَتْ .
Ethpa. أَحَمَنَّا	pass.	حَمَنَّا	عَيْرَقَ , ar. Stella Pleia-
Aph. أَحَمَنَّا	fumum excitavit,	دِيبَانَ	dibus proxima, capella.
	fumigavit ; suffivit, exhala-	حَمَنَّا	حَمَنَّا et حَمَنَّا
	vit.		Hyadum constellatio, sidus Orionis ; Pleia-
Ettaph. حَمَنَّا	oluit, redoluit.	حَمَنَّا	des.
حَمَنَّا	pl. حَمَنَّا	حَمَنَّا	حَمَنَّا , v. s. حَمَنَّا .
	exhalation, vapor, fumus ; incen-	حَمَنَّا	حَمَنَّا , v. s. حَمَنَّا .
	sum, thymiana, aroma ; trop.	حَمَنَّا	حَمَنَّا , v. s. حَمَنَّا .
	oratio tempore incensi reci-		
	tata.		
حَمَنَّا	odoratus.	حَمَنَّا	, f., heb. חַמְנָא , ar.
حَمَنَّا	fumosus, vaporatus.		عَيْنَ .
حَمَنَّا	pl. حَمَنَّا it. حَمَنَّا oleum	حَمَنَّا	1º oculus, f., pl.
	picenum, resina (ar. قَطْرَانٌ).		حَمَنَّا , حَمَنَّا et rarius , حَمَنَّا ; c. suff.
حَمَنَّا	, ar. عَطَارٌ, herbarius, phar-	حَمَنَّا	حَمَنَّا oculus meus ; pl.
	macopola (gall. herboriste,		حَمَنَّا , حَمَنَّا , acc. حَمَنَّا , oculi
	druquiste).		tui, sui, etc. ; trop. aspectus,

facies, superficies, cavitas; intelligentia; inoculatio; حَسْنٌ tu ipse. حَسْنٌ oculus malus, invidus. حَسْنٌ سَارْدِنِيَا oculus sardonyx gemma. حَسْنٌ مُعْجَمٌ oculus solis: orbis solis. حَسْنٌ أَوْلَادُ الْمُرْسَلِينَ chrysanthemum coronarium. حَسْنٌ تَحْتَ frons.; adv. c. praepos. حَسْنٌ vel حَسْنٌ oculus ad oculum: aperte, coram. حَسْنٌ حَلَّا, it. حَلَّا حَلَّا vel manifeste, aperte. حَسْنٌ anante oculum: coram, aperte. حَسْنٌ حَلَّةٌ vel حَلَّةٌ coram eo. 2º fons, ex præc. per metaph. deriv., pl. حَسْنَاتٌ, raro حَسْنَاتٍ.

Pa. حَسْنٌ v. denom., intuitus est, vidit; monstravit, designavit, ar. عَيَّنَ.

Ethpa. حَسْنٌ designatus est.

Ethpalp. حَسْنَاتٌ inoculatus est.

حَسْنَةٌ dimin., ocellus, ar. عَيْنَةٌ.

حَسْنٌ, حَسْنَاتٌ inoculatio, modus insitionis; it. oculis magnis praeditus, ar. أَعْيَنٌ.

حَسْنٌ f., fons, pl. حَسْنَاتٌ, حَسْنَاتٌ et rarius حَسْنَاتٌ.

Pa. حَسْنَةٌ m., et حَسْنَاتٌ f., dim., fonticulus.

حَسْنَةٌ fontanus.

حَسْنَةٌ inspiciens, intuens.

حَسْنٌ, v. s.

حَسْنٌ, v. s.

حَحْدَحٌ verruca, callum; scolymus planta (gall. cardon).

حَحْدَحٌ inus.; cfr. حَحْدَحٌ, ar. حَجَرٌ retinuit et عَكَرٌ turbavit.

Pa. حَحْدَحٌ impedivit, retinuit. حَحْدَهُونَ مَنْ وَمَدَهُونَ non impediverunt eum a proseguendo suo cursu. Part. حَحْدَهُونَ, حَحْدَهُونَ; adj. turbidus; visus impeditus.

Ethpa. حَحْدَهُونَ pass.

حَحْدَهُونَ impeditio, impedimentum; لَمْ حَحْدَهُونَ sine mora.

حَحْدَهُونَ, ar. عَكَرٌ, stirps; summa.

حَحْدَهُونَ discriminatio erinis in medio capite.

حَحْدَهُونَ impediens, deturbans.

حَحْدَهُونَ impediens; pl. f. حَحْدَهُونَهُونَ impedimenta.

حَلَّ et حَكَ inus.: cfr. heb. נָלַחַ, ar. لَهُ elephas est, et لَهُ auctus est pretio, transgressus est limites.

Pa. حَكَ elevavit, exaltavit; litatione vicit, c. لَهُ pers.; amovit, sustulit. حَكَهُونَ حَكَهُونَ مَبْرُدٌ edictum prius abro-

gavit. *Part. act.* مَدْنَأ , مَدْنَمْ . *Part. pass.* مَدْنَكْ , مَدْنَمْ , pl. مَدْنَمْ , emph. مَدْنَمْ , f. emph. مَدْنَمْ , pl. مَدْنَمْ مَدْنَمْ مَدْنَمْ excelsus, altus, eminens, sublimis, supremus; seq. مَفْ , superior, superans; pl. f. مَدْنَمْ res præstantes.

Ethpa. اَخَّكْ elevatus est, exaltatus est, ascendit; eventus est, se sustulit, eminuit; se substraxit; ablatus est, recessit, cessavit, c. مَهْ ; it. superior factus est, c. مَهْ .
Aph. اَحَّكْ obtulit; extulit; حَكْ pluris aequo pretium rei petiit, ar. أَغْنَى ; trop. prævaricatus est.

Schaph. حَكْ exaltavit. *Part. pass.* مَحَدْنَمْ ; *adj.* impudens, arrogans.

Eschataph. حَكْ مَدْنَمْ se extulit, ar. اَنْتَقَلَى superbus, arrogans fuit; seq. حَكْ , invectus est contra, dominatus est, contempsit.

Ethpau. اَخَّهُوكْ caligavit dies.

حَدْنَا transgressio, iniquitas. حَكْ , pl. حَكْ مَأْ , oblatio, holocaustum; ara; حَدْنَهُ مَهْ altaria.

اَخَّهُوكْ elevatio, ascensus, præstantia.

حَدْنَمْ , مَهْ arrogantia, superbia; elevatio, sublimitas.

حَكْ , a *præp.* حَكْ super, cfr. حَكْ , f. emph. حَكْ , pl. حَكْ مَأْ , excelsus; Supremus Deus, chald. נָבָרִין ; supremus, sublimis, *inde pl.* cælites, Angeli; superior, eximius; id quod antecedit, quod in fronte est, *inde libri* titulus; gramm. nomen duorum punctorum obliquorum (:) *ad interpunctionem inservientium.* حَكْ مَهْ لِهَلْيَنْ su- periores h. e. palatales litteræ; subst. *in f. emph.* femur. حَكْ مَهْ eminentia.

حَكْ مَهْ , heb. נֶרֶת , ar. عَلَيَّةَ , pl. حَكْ مَهْ cœnaculum; pinna.

حَكْ مَهْ sublime, magnifice, excellenter.

حَكْ مَهْ altitudo, sublimitas, *inde titulus honoris*; præstantia, excellentia, nobilitas; pretium.

حَكْ مَهْ exaltator; pallium.

حَكْ مَهْ sublimiter.

حَكْ مَهْ sublimitas, altitudo.

حَكْ مَهْ sublimis.

حَكْ مَهْ sublimi modo; sensu mystico, allegorice.

مَدْحُوتَهُمَا ascensus ; sensus
sublimior.

مَدْحُوتَهُمَا superbia, arrogantia.
مَدْحُوتَهُمَا jactantia, arrogan-
tia.

مَدْحُوتَهُمَا superbus, impudens.
مَدْحُوتَهُمَا arrogantia, super-
bia.

حَكَّ, pro inus. حَكَّ, heb.

ذِي, ar. عَلَى, cfr. حَكَّ *infra*; c.
sniff. حَكَّ, حَكَّوْب, حَكَّب, حَكَّم etc.; significat:

1º super, supra : sed sit super terram.
مَصْعَدَهُ كَلَّا أَتَبْرَأَ innititur super
خَبَّاباً كَلَّا وَقْفًا manus meas. servi equis insidentes ; it.
c. *verbis requiem, fiduciam* significantibus i. e. in sensu
moralis : كَلَّا مَهْدِيٌ وَ كَلَّا fretus
hae spe quod. كَلَّا سَهْدِي وَمَنْهِي cum auxilio Domini. كَلَّا مَهْدِي pacto firmiter stetisti ; it. c. *verbis praeceptum, imperium, revelationem significantibus* : كَلَّا أَمْهَمَانِي regnavit super Israel. كَلَّا دَمَتْرَا دَكَّهُو وَمَنْتَا constituit eis
judices. كَلَّا إِنَّا حَكَّهُ ego Dominus apparebo vobis. فَمَنْهِي كَلَّا mihi præscripsit. كَلَّا دَمَتْرَا وَمَنْهِي ære alieno oneror.

2º de, circa; ex. حَلَّ سَهْفَهُ tractatus de invidia.

فَمَنْهِي حَلَّ أَنْتَهُ præcepit de.

فَمَنْهِي حَلَّ سَهْفَهُ quum certior factus est de malis moribus ejus.

فَمَنْهِي حَلَّ سَهْفَهُ وَمَنْهِي مَهْدَهُمَا circa hec eadem verba volvitur doctrina :

فَمَنْهِي حَلَّ سَهْفَهُ مَاسِا ex gladio tuo vives.

3º insuper, ultra, praeter.

سَهْفَهُ إِسْتَهْفَهَ حَلَّ سَهْفَهُ præter hæc, quinque alia ta-

lenta lucratus sum.

4º ad, juxta, apud : كَلَّا

juxta puteum. حَكَّ apud me, ar. عَلَيْيَ, habeo, inde c. ver-

bis motus, aut impugnationis, amoris vel odii : ad, in, con-

tra, erga. كَلَّا أَحَمْهَتْهُ بَوْهِي ivit ad discipulos suos.

فَمَنْهِي حَكَّهُو وَمَنْهِي misit حَكَّ apud me irrupit in eum. دَمَتْرَا دَكَّهُو obsederunt eam. كَلَّا فَمَنْهِي domino suo gratus erat.

كَلَّا وَسَلَّا حَلَّ فَمَنْهِي omnibus terribili-

lis. فَمَنْهِي vobis oneri est. دَمَتْرَا دَكَّهُو in odio ei erat ; trop. secundum ; pro,

propter. كَلَّا فَمَنْهِي دَمَتْرَا دَكَّهُو secundum haec omnia præcepta.

فَمَنْهِي دَمَتْرَا دَكَّهُو reputati ut justi secun-

dum homines *seu* ab hominibus. حَلَّ secundum pactum. حَلَّ وَدَدْ vel abs. حَلَّ propter. ؟ حَلَّ eapropter. حَلَّ أَقْتَلَ id., وَهُوَ حَلَّ et هُوَ حَلَّ quapropter. ؟ هُوَ حَلَّ ea conditione ut, (ar. عَلَى أَنْ). حَلَّ وَبِهِ حَلَّ vel حَلَّ بِهِ حَلَّ propter hoc. حَلَّ مَهْ وَ حَلَّ ob id quod. حَلَّ مَهْ vel حَلَّ مَهْ, it. حَلَّ مَهْ quam-orbem ? quare ?

5º per, per medium *de loco et tempore*: حَلَّ مَهْ حَلَّ مَهْ per oppidum transibunt. وَهُمْ حَلَّ per somnum ejus. حَلَّ وَلَاحَ مَهْ intra duodecim dies; it. longe a: حَلَّ مَهْ ١٠٥١ مَهْ مَهْ distabat tribus millibus.

6º *Conjunctio est seq.* ؟ : quia, ut; dum. يُ حَلَّ quia non; وَهُمْ وَبِهِ حَلَّ dum hoc fiat.

7º *Componitur adverbialiter*
c. حَلَّ: حَلَّ sursum, supra;
وَحَلَّ qui superior, summus
est. حَلَّ حَلَّ ubique.
مَهْ فَإِنْ حَلَّ حَلَّ حَلَّ حَلَّ ex hoc
tempore et continuo usque...
حَلَّ مَهْ et حَلَّ مَهْ desuper,
supra. حَلَّ مَهْ مَهْ ineffabi-
lis. مَهْ حَلَّ مَهْ a summo
usque deorsum.

8º *Efformat tandem substanti-*

tiva. حَلَّ مَهْ adverbium.
حَلَّ مَهْ id.
جَلْ, id. q. حَلَّ, sed in sensu proprio tantum: super, supra; id quod supra est. جَلْ مَهْ مَهْ supra habitationem meam; c. suff. حَلَّ مَهْ, etc. supra te.

جَلْ , ar. غَلَبَ fut. جَلْ oppressit, fraudavit; vicit, superavit, c. حَلَّ vel حَلَّ . حَلَّ حَلَّ مَهْ praeponderavit. Part. pass. حَلَّ حَلَّ , f. emph حَلَّ حَلَّ ; it. iniquus.

Ethpe. حَلَّ حَلَّ pass., c. حَلَّ vel nng. حَلَّ pers. vel rei.

Pa. حَلَّ vicit, c. حَلَّ ; oppressit. حَلَّ لَادِبَنَا مَهْ حَلَّ temeraria disceptatio magis ipsa viperā nocet.

Ethpa. حَلَّ حَلَّ pass. حَلَّ حَلَّ et حَلَّ حَلَّ oppressio, vis; praecellentia.

جَلْ حَلَّ fraus, violentia.
جَلْ حَلَّ fraudulentus, avarus.
جَلْ حَلَّ حَلَّ injuste.

جَلْ حَلَّ حَلَّ fraudulentia, injuria, oppressio; vis, praestantia; avaritia, cupiditas.

جَلْ حَلَّ حَلَّ inique.
جَلْ حَلَّ حَلَّ oppressio, defraudatio.

حَمْدُهَا, *f.*, *ar.* غَبَّةٌ, capsā, cymbium.

حَمْدُهُمْ superabilis. **حَمْدُهُمْ** invictus.

حَمْدُهَا, *al.* مَدْحَى, scutica, virgæ, *cfr.* مَحْدَى.

حَمْدًا et **حَمْدًا** vas e corio confectum, uter; *cfr.* حَمْدًا *supra*. **حَمْدًا** et **حَمْدًا** status vigiliae. **حَمْدًا** et **حَمْدًا** aloë. **حَمْدًا**, *v. s. præp.* حَمْدًا.

حَمَّلَ, *ar.* حَمَّلَ, chald. צְלַל, *fut.* تَكَمَّلَ, *imp.* حَمَّلَ infin. حَمَّلَ et حَمَّلَ intravit, ingressus est, accessit, *c.* حَمَّلَ, حَمَّلَ, *trop.* incepit. حَمَّلَ أَبْرَأَ prævaluit, potitus est. حَمَّلَ دَهْمَهُمْ inverunt jumento: juramento pacti sunt. حَمَّلَ penetravit in delictum suum *h. e.* agnovit illud; supervenit, aggressus est, *spec. c.* حَمَّلَ, حَمَّلَ mulierem cognovit, *c.* حَمَّلَ . مَوْلَاهُمْ حَمَّلَ introivit in secreta ejus: ejus consuetudine usus est. حَمَّلَ حَمَّلَ provectus erat annis.

حَمَّلَ sectæ adhæsit. حَمَّلَ حَمَّلَ intravit et exivit inter nos Dominus Jesus, *i. e.* versatus est inter nos. حَمَّلَ مَوْلَاهُمْ

adivit eum. حَمَّهُ مِنْهَا incepit annus. حَمَّهُ مِنْهَا subiit. *Part.* præs. حَمَّهُ, *f.* حَمَّلَ et حَمَّلَ, *pl.* حَمَّلَ vel حَمَّلَ, *f.* حَمَّلَ vel حَمَّلَ.

Ethpe. حَمَّلَ introductus est, se introduxit.

Pa. حَمَّلَ induxit, introduxit; prætexuit, *ar.* عَلَى causas, rationes protulit. *Part. pass.* حَمَّلَ annis provectus.

Ethpa. حَمَّلَ prætexuit, causas protulit; *it.* intravit in locum; invasit aliquem Satanás, *c.* حَمَّلَ.

Aph. حَمَّلَ, *heb.* הִנֵּל (Aph. *v.* inus. צְלַל), *imp. c. suff.* حَمَّلَ, etc., introduxit; attulit, obtrulit; intulit, induxit; crimen intulit alicui, *c.* حَمَّلَ; حَمَّلَ حَمَّلَ se introduxit; حَمَّلَ حَمَّلَ substituit. حَمَّلَ حَمَّلَ intromisit eum ad regem; *it.* intravit.

Ettaph. حَمَّلَ introductus est.

Palp. حَمَّلَ denom. a حَمَّلَ, flatu dissipavit; *cfr.* حَمَّلَ *s. حَمَّلَ.*

Ethpalp. حَمَّلَ procella agitatus est.

حَمَّلَ et حَمَّلَ ingressus. حَمَّلَ, it. حَمَّلَ et حَمَّلَ, *heb.* حَمَّلَ, *ar.* حَمَّلَ, rubus.

مُكْتَمِلٌ introductus; intrans, accidentalis, ab extra veniens; gram., insertus, *littera* præfixa, non radicalis.

مُكْتَمِلٌ introductio, insertio.

مُكْتَمِلٌ introductio.

مُكْتَمِلٌ, مُكْتَمِلٌ introductus, ingressus; intrans. مُكْتَمِلٌ, مُكْتَمِلٌ annis provecti.

مُكْتَمِلٌ ingressus.

حَلٌّ, emph. اَدْدَارٌ, st. const. مُكْتَمِلٌ, pl. مُكْتَمِلٌ, emph. اَدْدَارٌ مُكْتَمِلٌ, ar. عَلَى, causa; occasio, prætextus; res, opus; suppellectile; criminatio; præelectio *libri*; apologus; gramm. radicalis. مُكْتَمِلٌ حَدَّمَوْلًا causa efficiens. مُكْتَمِلٌ حَدَّمَتْ variis de causis. مُكْتَمِلٌ حَدَّمَتْ omnibus modis. مُكْتَمِلٌ... لَا nullo modo. مُكْتَمِلٌ اَقْتَابٌ دُخْلٌ ex dupli causa. دُخْلٌ vel مُكْتَمِلٌ propter. مُكْتَمِلٌ vel مُكْتَمِلٌ ea de causa quod. مُكْتَمِلٌ ejus causa, ejus culpa. مُكْتَمِلٌ... لَا مُكْتَمِلٌ erroris quorumdam de ea re hæc est causa.

مُكْتَمِلٌ causalitas.

مُكْتَمِلٌ a causa proceedens, effectus; causalis; gramm. adjec-tivum; *particula* causalis.

مُكْتَمِلٌ id.; gramm. accusati-vum (*عِزْيَزِيَّةِيَّةِ*).

مُكْتَمِلٌ causaliter; data occa-sione.

مُكْتَمِلٌ, pl. مُكْتَمِلٌ et مُكْتَمِلٌ, ar. مَلَأَ, proventum, seges, redditus.

مُكْتَمِلٌ et مُكْتَمِلٌ a part. Pa., introducens causam vel rem alicujus, inde pastor, spec. spiritualis, præsul.

مُكْتَمِلٌ, v. s. حَلٌّ.

مُكْتَمِلٌ, emphat. f. اَمْكَنْتَلٌ, pl. m. مُكْتَمِلٌ, nnq. مُكْتَمِلٌ, st. c. مُكْتَمِلٌ, pl. f. اَمْكَنْتَلٌ introitus, ingressus; trop. initium; adverb. اَمْكَنْتَلٌ وَهُوَ initio jejunii; it. in f. emph. introductio; dedicatio ecclesie; expeditio militaris; proventus, redditus.

مُكْتَمِلٌ ingressus, aditus; pallium monachale.

مُكْتَمِلٌ introductio; institutio.

مُكْتَمِلٌ f., it. مُكْتَمِلٌ, pl. مُكْتَمِلٌ, turbo, procella.

مُكْتَمِلٌ procellosus.

مُكْتَمِلٌ, f. مُكْتَمِلٌ turbine com-motus.

مُكْتَمِلٌ tumultus.

مُكْتَمِلٌ ap. gramm., cau-sativus.

مُكْتَمِلٌ introductio.

حَلْمٌ, *in us.*, *cfr. ar.* غَلَمٌ, puber fuit.

Pa. حَكْمٌ *denom. a* حَكْمٌ, juventutem renovavit; roboravit, laudibus extulit; *it. denom. a* حَكْمٌ, verba doxologiae حَكْمٌ حَكْمٌ (in saecula saeculorum) iteravit.

Ethpa. حَكْمٌ adolevit, juvenis factus est; maturus fuit fructus; renovatus est.

حَكْمَةٌ adolescentia; renovatione.

حَكْمٌ, *emph.* حَكْمٌ, *ar.* غَلَمٌ, *heb.* حَنْزَنٌ, *pl.* حَكْمَتٌ, *c. suff.* 1st pers. *pl.* حَكْمَتٌ, *puber, famulus, adolescens; puer, servus, f.* حَكْمَةٌ, *pl.* حَكْمَةٌ, *f.* حَكْمَةٌ وَحَكْمَةٌ, *capite intonsa puella, laica. حَكْمَةٌ وَحَكْمَةٌ* juvenili mente.

حَكْمَةٌ juveniliter; strenue. حَكْمَةٌ *dim.*, adolescentulus. cælebs.

حَكْمَةٌ adolescentia, *juventus. حَكْمَةٌ* juvenilis; strenuous.

حَكْمٌ, *st. emph.* حَكْمٌ, æternitas, ævum, tempus indefinitus, saeculum præteritum *vel futurum; cfr. heb.* שָׁלֹשׁ, *a* שָׁלֹשׁ occultavit. مَلْعُونٌ حَكْمٌ

regnum æternum. مَهْمَةٌ فِي حَكْمَةٌ æternus.

حَمْدٌ a diebus antiquis.

حَمْدٌ كَهْ حَمْدَتٌ semper Virgo Beata Maria.

حَمْدٌ حَمْدَتٌ usque in perpetuum.

حَمْدٌ حَمْدَتٌ sepulcrum; *in comp. c.* حَمْدٌ et حَمْدٌ حَمْدَتٌ vel حَمْدَتٌ in ævum, in saecula; لَمْ حَمْدٌ nunquam; *adject, c.*, حَمْدٌ وَحَمْدَتٌ et حَمْدَتٌ æternus; *c.* حَمْدٌ فِي حَمْدَتٌ ab antiquo; ab æterno. لَمْ حَمْدٌ لَمْ حَمْدَتٌ nunquam antea.

Per extensionem: saeculum præsens, mundus, *ar.* عَالَمٌ, *st.*

حَمْدٌ حَمْدَتٌ vita in carne; *trop.* turba, vita saecularis;

فَقْمَسٌ وَحَمْدٌ sacerdos saecularis. حَمْدٌ حَمْدَتٌ mundus iste, *per opp. ad* حَمْدٌ mundus futurus;

حَمْدٌ حَمْدَتٌ, laicus; *it. res* mundanæ, homines: وَحَمْدَتٌ حَمْدَتٌ res hujus saeculi, profana.

فَدْهُ حَمْدَتٌ حَمْدَتٌ orbis terræ. حَمْدَتٌ حَمْدَتٌ geo-

graphia, orbis descriptio; *it. trop. per extens.* copia, penus.

حَمْدَتٌ حَمْدَتٌ saecularium more.

حَمْدَتٌ حَمْدَتٌ saecularis, mundanus; laicus.

حَمْدَتٌ حَمْدَتٌ mundanitas, vita saecularis.

حَمْدَتٌ حَمْدَتٌ æternus.

حـمـنـةـمـ sempiterne.

حـمـنـةـمـاـ æternitas.

حـمـنـةـمـ more sæculi, mundane.

حـمـنـةـمـ sæcularis, laicus; terrenus, mundanus; popularis; pl. f. **حـمـنـةـمـاـ** res humanæ, res vanæ. **حـمـنـةـمـ** مـهـمـاـ وـاـ **حـمـنـةـمـ** dialeucus vulgaris.

حـمـنـةـمـ mundi status.

حـمـنـةـمـ, v. s. **حـ**.

حـلـمـ, *in us.*, cfr. عـيـنـ adhæsit.

Pa. **حـمـ** suspendit, *ar.* عـلـقـ.

Ethpa. **حـمـ** certavit, adversatus est, restitit; viscosus fuit.

حـمـمـ et **حـمـمـاـ**, *heb.* עـזـקـהـ, *ar.* عـلـقـةـ, sanguisuga; *adj.* viscosus.

حـمـمـ et **حـمـمـاـ** viscositas.

حـمـمـ et **حـمـمـاـ**, *pl.* **حـمـمـ**, *heb.* حـمـمـ, sanguisuga; tormen, morbus bovinus vel equinus.

حـمـ, *heb.* حـ, *ar.* مـ, *c.* suff. حـ, حـفـ, حـفـفـ, etc.

1º *Est particula concomitanitæ, concursus, simultaneitatis*: cum; una cum, simul; conjunct. simul ac. مـ وـلـاـ وـمـ حـمـ دـمـ qui non est mecum contra me est. حـمـ

cum eo, illo præsente. **حـمـ** illi qui cum ipso erant i. e.

comites ejus. **حـ** سـتـ consentientibus episcopis. **حـ**

أـلـاـ مـهـمـاـ مـهـمـاـ وـلـاـ مـهـمـاـ et cum omni hac excellentia; licet tanta fuit ejus excellentia **حـمـ** مـهـمـاـ وـلـاـ مـهـمـاـ secus, juxta fluvium. **حـ** مـهـمـاـ وـلـاـ مـهـمـاـ simus, ingressus est. **حـمـ** وـلـاـ مـهـمـاـ adhuc eo loquente. **حـ** مـهـمـاـ وـلـاـ مـهـمـاـ statim ac profecti sumus.

2º *Ponitur pro præpos.* **حـ**, *c.* **حـ** apud, penes. **لـوـلـ** **حـمـمـ** apud eos erat: secum habebant, ad ipsos pertinebat.

3º *Respondet præp.* **حـ**, *c.* **حـ** verbis affectum, odium, pugnam significantibus: in, erga; contra, adversus. **سـهـمـ** وـلـاـ **حـمـ** **لـوـلـ** amor quo erga eum affectus erat. **حـمـ** مـهـمـاـ مـهـمـاـ dimicabat contra eum.

4º *Efformat varias locutiones:* **حـ** فـكـهـاـ وـلـاـ **حـ** cum toto hoc: hoc non obstante. **حـ** وـلـاـ وـافـ **حـ** præterea quod. **حـ** وـلـاـ وـفـ زـاـ sub auroram. **حـ** حـ a latere.

حـ, *in us.*, *ar.* عـيـنـ cæcus factus est.

Pa. **حـ** cæcus, obcæcatus fuit.

عَنْدَ ambra, ar.

جَمِيعًا، وَسُبْرَةٌ جَمِيعًا.

mersus est, se immersit, altius subiit, *inde occidit sol*, etc.; adiit, descendit, *c.* ﴿
vel ۚ; penetravit, *c.* ۏ; *trop.* marcuit *flos*; *it.* se lavit; baptizatus est *Sacramento Baptismi*. *Part.* *præs.*
حَذَّبَ ۖ **أَنْ** ; **حَذَّبَا** ; **baptizo**. *Part.* *præt.* **حَذَّبَ** ; **حَذَّبَمَا** ; **baptizatus**, **baptizan-**
dus.

Ethpe. مُحَمَّدٌ baptizatus est.

Aph. حَفَّى mersit, immersit ;
abluit; baptizavit; baptizare
fecit; *cfr. ar.* حَفَّى. *Part. act.*

بَمْدُخَلٌ . Part. pass.
بَمْدُخَلٌ . bantizatus.

حَمْدًا casus, lapsus, occasus
solis, stellæ; immersio; baptisma, actus *seu* ritus baptizandi; حَمْدًا مُنْتَهٰ baptismus dominicus *h. e.* verus. حَمْدًا وَحَمْدًا festum Baptismi *Dominii*, Epiphania. حَمْدًا baptisterium.

بَصْرَةٌ baptismus.

لِجَانٌ immergens; urinator
(gall. plongeur); baptizan-
dus.

جَعْدَهُ، *heb.* גַּעֲדָה, a rad.

עַמְדָה stetit, ar. عَمُودٌ, column; suggestum, tribunal.

مَحْمُد بْنُ جَعْلَانٍ qui baptizat ; **جَعْلَانٌ** Joannes Baptista, ar. **الْمَعْدَان**.

مَحْمَدٌ وَمَدْا piscina ; ablutio ;
 baptismus ; baptisterium ;
 مَحْمَدٌ وَمَدْا id. مَحْمَدٌ وَمَدْا
 baptismus lacrymarum : pœ-
 nitentia. حَنْدَهُ وَمَدْا filius
 spiritualis (*gall.* filleul) ; it.
 ejusdem baptismatis parti-
 ceps, fidelis.

حَدَّثَ, fut. **تَحْدِثُ** obscur-
rus factus est, cfr. **حَدَّثَ**
densus fuit; it. **مُهَدَّثٌ** **حَدَّثَ**
وَنْدَلَ neglexit, contempsit,
ar. **حَدَّثَ**.

Pa. ~~an~~ obscuravit.

Ethna, ~~اٹھنہ~~ pass.

Aph. **حَفَّ** obtenebravit; obscuravit.

Ettanh. एत्तं हि पास

كَلِيْجَوْ et **كَلِيْجَنْ** et **كَلِيْجَهْ** caligo, tenebræ.

جَعْدَهُ، جَعْدَهُ et جَعْدَهُ te-
nebrosus, obscurus ; gramm.

نَمْذَنْتَ حَمْدَهُ *nomina* quo-
rum femininum non constat.

حُكْمٌ obscure.

لَهُمْ وَلَهُمْ دُمُّهُمْ et لَهُمْ دُمُّهُمْ obscuritas.

حَدَّهُنَا obscuratus.

حَدَّهُنَا obscurans.

حَدَّا, *heb. حَدَّا*, *ar. حَدَّا*, *عَوْلَ*, *fut.* *تُحَدِّدَ*, *imp. pl.* *حَدَّهُنَّا*, laboravit, se defatigavit; laborem impendit, *c.* *ت*; *trop.* labori, exercitiis vitae asceticæ se dedit. *حَدَّهُنَّا وَقَرَّهُنَّا* egit in eo segnities, *h. e.* occupavit eum. *Part. act.* **حَفَّا**, *حَدَّلَ* se defatigans, laboriosus: *it.* **حَخَلَ**, *in sensu ar.* *عَامِلٌ*, præfector. *Part. pass.* **حَدَّا**, *حَدَّلَ* defatigatus, laboriosus; morbo laborans; laboribus vitae spiritualis vacans, asceta; *it.* ægre factus, labore plenus.

Ethpe. **حَادَّا** laboravit; *أَحَدَّا حَدَّكَمَا* peccato reus fuit. *أَحَدَّا حَمَدَّا* conflictu spirituali impugnatus est.

Aph. **حَفَّا** defatigavit, molestavit; laborem, onus impo-suit.

حَفَّا, *حَمَلَ*, *pl.* *حَمَلَ*, *labor*, fructus laboris; agendi modus; labor vitae asceticæ; *it.* *ar.* *عَوْلَ*, provincia, præfектura. *بِلَّا حَمَلَ* sine labore; libenter.

حَمَلَ dim., labor exiguus.

حَمَلَأْمَة cum labore, cum cu-ra.

حَصَنَكَمَا defatigatio.

حَمَدَهُنَا laborans, operarius.

حَمَدَهُنَّا laboriosus.

حَمَلَلَهُنَّا, *emph.* *مَحَمَلَهُنَّا*, tapes; *cfr.* *أَهْلَلَ*.

حَمَّا, *pl.* **حَمَّاتٍ**, *emph.* **حَمَّاتٍ** *c. suff.*

حَمَّاتٍ etc., gens, populus; *in sing.*, *spec.* populus Judaicus, *per oppos.* *ad pl.* gentes, *spec.* ethniciæ; turba, secta; *cfr.* *ar.* *عَمَّ* communis, universalis fuit, *et عَمَّ* totalitas, multitudo, *it.* *heb.* *نَّ* natio; *construitur* **حَمَّا** *sæpe c. verbo in plur.* utpote nomen collect:

حَمَّا vidit populus.

حَمَّا populus tuus sanctus.

حَمَّا unaquæque gens.

حَمَّا **حَمَّا** inter omnes gentes.

حَمَّا qui ejusdem gentis est, congener; laicus; populus, *f.* **حَمَّاتٍ**, *pl. m.*

حَمَّاتٍ populus; plebeii.

حَمَّاتٍ gentilis.

حَمَّاتٍ gentilis; plebeius, laicus.

حَمَّاتٍ popularis.

حَمَّاتٍ spurius.

حَمْدَه et حَمْدَه ا، id. q. ar. هَمَّة، amita, pl. حَمْدَه ا et حَمْدَه ا.

حَمْدَه ا، vox ar. عَنَامَة، cidaris (gall. turban).

حَمْرَه ، fut. حَمْرَه، imp. حَمْرَه clausit, spec. oculos; in sepulcro inclusit; cfr. ar. غَصَنْ id., et عَيْشَ caligavit oculus. Part. pass. حَمْرَه.

Ethpe. حَمْرَه ا pass.

Pa. حَمْرَه oculos clausit; claudere fecit, inde somnum induxit, morienti oculos pressit.

Ethpa. حَمْرَه ا clausus est; abs., clausos oculos habuit.

Aph. حَمْرَه ا clausit oculos; trop. repressit sensus.

حَمْرَه ا، et حَمْرَه ا occlusio.

حَمْرَه ا et حَمْرَه ا id; lippitudo oculorum, ar. عَصَنْ .

حَمْرَه ا rheum herba, cfr. مَحْمُرَه .

حَمْرَه ا f., cfr. حَمْرَه ا، ar. آوِص et عَابِص caro minus aequo cocta; frustum, panis bucella.

حَمْدَه ، inus.; cfr. heb. حַמְדָה، ar. هَمَّقْ profundus fuit.

Pa. حَمْدَه profundum fecit; profunde, altius subiit; inde adverbial. et trop., seq. alio verb. usque ad summum, pe-

nitus. حَمْدَه مَسْخَه penitus se corruperunt. حَمْدَه حَمْتَه intente me defixerunt.

Ethpa. حَمْدَه ا profundus factus est; depresso est; se altius demisit, immersit.

Aph. حَمْدَه ا profundum fecit.

Ettaph. حَمْدَه ا penitus investigatus est.

حَمْدَه ا، pl. حَمْدَه ا profunditas, profundum; locus depresso, vallis; extremus gradus rei: قَبْلَ حَمْدَه ا وَمَسْخَه ا كَذَّبَ cum ad extremam senectutem pervenisset; it. in pl. ut حَمْدَه ا.

حَمْدَه ا profunditas; gramm. nomen vocalis ó vel ə.

حَمْدَه ا profunda investigatio.

حَمْدَه ا profunditas, cava-
tas.

حَمْدَه ا، حَمْدَه ا profundus, depresso; trop. difficilis, arduus; astutus; extremus, summus; حَمْدَه ا حَمْدَه ا somnus gravis; حَمْدَه ا حَمْدَه ا Cœlesyria.

حَمْدَه ا حَمْدَه ا summo mane; subst. vena cardiaca.

حَمْدَه ا profunde.

حَمْدَه ا profunditas; pl. حَمْدَه ا meteora.

حَدَّة, fut. **نَدَّهَنْ** habitavit; commoratus est; trop. versatus est in re, c. ح.; cohabitavit, c. حَمَّلْ, inde con-nubio conjunctus est; it. habitatus est; cfr. عمر habitatus est locus; ædificavit; it. عمر diu vixit; prosper fuit, floruit. **وَجْهَهَنْ** حَمَّلْ apud ipsum habitavit. **وَجْهَهَنْ** عَلَمَنْ نَدَّهَنْ ut vitam tranquillam agamus. Part. act. **حَدَّهَنْ**, habitator, f. حَدَّهَنْ q. v. infra; **حَمَّهَنْ مَمْحَتَنْ** habitantes tentoria, Nomades. Part. pass. **حَدَّهَنْ**, **حَدَّهَنْ**; impers. **كَوْ** حَمَّنْ حَمَّنْ habitabat; subst. al. sensu v. infra.

Ethpe. **أَحَدَهَنْ** habitatus est. Pa. **حَمَّنْ** ut usitat. seq. Aph. **أَحَدَهَنْ** habitare fecit, habitatoribus implevit urbem; seq. حَمَّلْ, nnq. **كَمَّا**, coabitare fecit, cohabitare sivit, inde matrimonio junxit; it. ut Pe., habitavit. Part. pass. **مَدَّهَنْ**, **مَدَّهَنْ**; subst. habitatio in regione alienigena condita; habitaculum. **خَمَّهَنْ** id. **خَمَّهَنْ** **مَدَّهَنْ** id. **خَمَّهَنْ** socius habitationis.

Ettaph. **أَحَدَهَنْ** stabilitus est. **حَمَّهَنْ** habitatio, sedes; ædi-

ficatio; حَمَّهَنْ وَأَفْحَنْ inhumatio; it. ut seq.

حَدَّهَنْ habitatio.

حَمَّهَنْ habitatio, habitaculum, domicilium, familia: cœnobium; it. vitæ ratio, cursus vitæ, ar. عمر.

حَدَّهَنْ cœnobita.

حَمَّهَنْ ædificatio.

حَدَّهَنْ, **دُعَهَهَنْ** inquilinus, habitator: f. **حَدَّهَنْ**, pl. **حَدَّهَنْ**, cohabitatrix, nnq. malo sensu, concubina.

حَدَّهَنْ habitatio.

حَدَّهَنْ habitata regio, orbis terræ; it. *absol.* orbis habitatus.

مَدَّهَنْ v. s. Aph.

مَدَّهَنْ conditor urbis.

مَدَّهَنْ, f. **مَدَّهَنْ** habitabilis terra; it. subst. in st. emph. orbis terrarum.

حَدَّهَنْ, **حَدَّهَنْ** foenum, herba; cfr. heb. שְׁמַר manipulus, ar. غَوْر pabulum jumenti.

حَدَّهَنْ, chald. لَانَهَنْ, heb.

لَانَهَنْ **حَدَّهَنْ** **لَانَهَنْ** lana: **لَانَهَنْ** **لَانَهَنْ** vestiti: monachi.

حَدَّهَنْ **دَهَنْ** gossypium.

حَدَّهَنْ **مَهَنْ** **حَدَّهَنْ** et **حَدَّهَنْ** **وَمَهَنْ** algæ marinæ.

حَدَّهَنْ **لَانَهَنْ** laneus, laniger.

حَدَّهَنْ monile colli.

حَتَّا , *heb.* צָהָה , fut. حَتَّتْ ;
 respondit, c. حَتَّا , *nnq.* c. acc.
 حَتَّا أَنْسَمْ , exaudivit ; con-
 versatus est, c. حَتَّا pers.
 vel حَتَّا ; versatus est, se appli-
 cavit, c. حَتَّا rei, ar. عَنِي , اعْتَقَى ;
 impers. حَتَّا حُلْمٌ curam gessit;
 it. cantavit, ar. غَنَى ; imp. c.
 suff. 1^{er} p. sing. حَتَّلْ , 1^{er} p. pl.
 حَتَّلْ , 3^{er} pers. حَتَّلْ , f. حَتَّلْ
 exaudi me, nos, etc. Part.
 act. et præs. حَتَّا , حَتَّا res-
 pondens ; se occupans. Part.
 pass. præt. حَتَّا , pl.
 حَتَّا , emph. حَتَّتْ versatus,
 occupatus ; sollicitus, studio-
 sus. حَتَّا حَوْهَمْ ut in
 jejunio occuparentur. حَسْبَهْ لِهِ حَتَّا laetitia indulgebat.

Ethpe. اخراج exauditus est;
se afflixit; *spec. ut Pe.*, con-
versatus est, occupatus est;
se occupavit, *rei vacavit*; *nnq.*
cohabitavit, cognovit mulie-
rem, *c.* ↗.

Pa. حَكَّ, *ar.* غَنِيٌّ, *cecinit*, *cantavit*. *Part. act.* مَحْكُمًا.

Ethpa. أَحْتَلَ pass.; respondit.

Aph. $\ddot{\text{a}}$ alterne cantare fecit; cecinit; *it.* occupavit in re.

Pali ፳፻፷ ad asceticam vitam
adstrinxit.

Ethpali اخْتَلَفْ operam dedit,
se applicuit *rei*, *c.* ح., *vel* ﴿, *vel acc.*; sollicitus fuit, *ar.*
اعْتَقَى; ascetice vixit.

حُتَّا cura ; it. ut seq.
حُنْدًا responsio, pl. حُنْدَاتٌ
responsiones, antiphonæ a
populo recitatæ in Liturgia.
حُنْتَا, حُنْتُمْ ; pl. حُنْتَاتٍ, conver-
satio, colloquium ; convictus,
societas, consuetudo ; com-
mercium carnale ; studium,
occupatio ; sensus, significa-
tio. حُنْدًا حُنْدَهُومَا vita solita-
ria. حُنْدًا societatem
imiit. حُنْدَاتٌ وَحُنْتَاتٌ أَحْنَانٌ مَحْنَانٌ
۲۰۱ cum quo nos diu versati-
sumus ; it. ut حُنْدًا, responsio,
responsorium ; hymnus. دَسَّدَ
حُنْدًا حَنَّ sodalis amicitia frui-
tus est.

 familiaris.

حَمْنَادُ cantus, hymnus.; res-
ponsorium, pl. حَمْنَادَاتُ.

حَمْدًا, f. **حَمْدًا** afflictus; asceticus, asceta, monachus.

ابنگیتیه abnegatio, abstinentia;
exercitatio, vita ascetica vel
cœnobitica.

responsorium in cantu liturgico.

جَنْدِي cantor.

Le^on^gars cantoris, cantus.

حُمَّةٌ et حُمَّةٌ stomachus ruminantium.

حُمَّيْتٌ cantor, ar. فَقِيرٌ.

حُمَّيْتٌ cantus.

حُمَّيْتٌ pl. حُمَّيْتٌ conversatio, consuetudo, familiaritas; حُمَّةٌ familiaris; it. can-
ticum, responsum, anti-
phona.

حُمَّةٌ humilitas.

حُمَّةٌ f., coll. cfr. heb. حُمَّةٌ , ar. حَانَ ovis: c. suff. حُمَّةٌ خَانٌ, حُمَّةٌ خَانٌ, etc., pecus spec. ovium. حُمَّةٌ pl. حُمَّةٌ custos gregis, cognomen canis.

حُمَّةٌ f., emph. حُمَّةٌ , heb. حُمَّةٌ , ar. حَنْبَلٌ, in pl. c. حُمَّةٌ uva. حُمَّةٌ أُوفَّا mandragora. حُمَّةٌ حَكَّهُمَا omphacium (gall. verjus). حُمَّةٌ نَمَّا et حُمَّةٌ نَمَّا solanum nigrum.

حُمَّةٌ hemorroidis species, sic dicta ex forma simili uræ.

حُمَّةٌ dim. præc.

حُمَّةٌ vox ar. عنجرة, labiis prominentibus præditus.

حُمَّةٌ , cfr. ar. عَيْدَةٌ deflexit a via, fut. حُمَّةٌ defecit, desiit; abiit, migravit, discessit, amotus est, c. حُمَّةٌ مِّنْ حُمَّةٌ ; مِنْ a mundo discessit; defunctus

أَحْمَمْتُ est; it. absol. obiit.

وَلَهُمْ لَا حَمَّةٌ كَوْنَتْ nix a ver-
tice montis non desivit. لَا تُنْبِتْ

كَمْ مَمْتَأْتِي وَمَمْمَأْ حَمَّةٌ فَمُسْ فَمُسْ ne deficiam, h. e. ne obeam in die mortis extra tuam vineam.

Ethpe. أَحْمَمْتُ amissus est.

Pa. حُمَّةٌ dimisit, amovit.

Ethpa. أَحْمَمْتُ أَحْمَمْتُ sepulturæ tradi-
tus est.

Aph. أَحْمَمْتُ deficere fecit, mor-
tem intulit.

حُمَّةٌ ut seq; it. philomela, cfr.
ar. غَنَّابِي. id.

حُمَّةٌ et saepius بَعْدَهُ, amotio, mi-
gratio, discessus, spec. mors. حُمَّةٌ peregrinator; defunc-
tus.

حُمَّةٌ , pl. حُمَّةٌ , حُمَّةٌ absens;
defunctus.

حُمَّةٌ ad defunctos spectans.

حُمَّةٌ , contr. a حُمَّةٌ , st. c. حُمَّةٌ vel حُمَّةٌ , ar. حَنْرَةٌ , heb. حُمَّةٌ , caper, capella constellatio; حُمَّةٌ طَهْوَةٌ , caper montanus, حُمَّةٌ هِرْهُرٌ hircus silvestris. حُمَّةٌ أَمْلَأْ حُمَّةٌ cervus. antilops.

حُمَّةٌ caprarius.

Ethpa. أَحْمَمْتُ v. denom., capra-
rius factus est.

حُمَّةٌ , ar. عَنْزَرَوتٌ , sareocolla.

جَهْ, fut. جَهْ fœtuit; com-planavit, disposuit.

جَهْ f., pl. جَهْ, heb. حَنْتָ, ar. عَنَانٌ, nubes, nebula; it. argentum vivum.

Pa. حَنْتָ v. den., obnubilatus est.
Ethpa. حَنْتָ pass.

Palp. حَنْتָ obnubilavit.
جَهْ nebulosus.

جَهْ nebulositas, caligo.

جَهْ, ar. عَنِينٌ, impotens ad conjugium.

جَهْ potentia ad copulam.

جَهْ, inus., præter part.
جَهْ a diabolo vexatus; cfr. ar. عَنْتَ durus fuit et عَنْتَ vexavit.

جَهْ f., juba equi; plur. حُنْقَاتٌ, it. ut seq.

جَهْ ramus, heb. حَنْ, pl. حُنْقَاتٌ.

Ethpa. حَنْتָ denom., jubatus fuit equus, crista prædictus fuit gallus.

جَهْ f., pl. حُنْقَاتٌ, surculus, ramus. حَنْتَةٌ وَحْنَدٌ palmites vitis; it. ligamen; it. struthiocamelus, vel fabulosa avis, ar. الْعَنَّا.

Ethpa. حَنْتָ den., ramificavit.

جَهْ, pro حَنْمَا, torques, monile; cfr. heb. حَنْكָ, ar. عَنْقٌ, col-lum.

جَهْبَوْ, ar. عَنْثُودٌ, botrus.

جَهْ, fut. جَهْ iniquus fuit, vix usit., cfr. heb. حَنْשָׁ, ar. حَنْشَ deliquit, et حَنْهَ.

جَهْ, حَنْهَا malus, iniquus; f. pl. حَنْهَاتٌ.

جَهْ improbe, scelest.

جَهْ nequitia, fornicatio.

جَهْ, heb. حَنْشָׁ, ar. عَنْبَرٌ, herba, gramen.

جَهْ وَأَوْنَاتٌ orobanche herba.

جَهْ herbescens.

جَهْ, fut. جَهْ agitatus est, commotus est.

Ethpe. حَنْتָ angustiis dis-tentus est.

Pa. حَهْ sollicitus fuit.

Ethpa. حَنْتָ curis disten-tus fuit; cfr. ar. إِعْنَسٌ valde sollicitus fuit de luero.

Palp. حَهْ distraxit, occu-pavit.

Ethpalp. حَنْتָ distractus est; fissus est.

جَهْ investigatio, studium; nugae, garrulitas.

جَهْ iniquus, perversus.

جَهْ cura, sollicitudo.

حَسْنٌ asperitas; cura, distractio.

حَسْنٌ, ar. عَقْدٌ, fut. نُجْدٌ difficultis fuit, c. حَسْنٌ pers.; se defatigavit; لَا فَعْلَمْ كُو حَسْنٌ non præcipitur tibi ut defatigeris. Part. præt. حَسْنٌ, حَسْنٌ, ut usitatus حَسْنٌ.

Ethpa. حَسْنٌ se difficilem, contentiosum præbuit, inde detrectavit, restitit; indignatus est; it. difficilis fuit res vel difficilis inventa est; vexatus est, male se habuit.

حَسْنٌ difficultas.

حَسْنٌ, f. emph. حَسْنٌ difficultis, molestus, periculosus; durus, arduus, gravis; subst. in pl. f. حَسْنٌ difficultates, molestiae; impedimenta; sarcinæ.

حَسْنٌ difficulter.

حَسْنٌ difficultas, asperitas; gravitas, durities. حَسْنٌ وَسْعَنَا arcis difficilis aggressus; adv. حَسْنٌ اهْرَمْ angustia respirationis. حَسْنٌ مَرْوِيْا pervicacia indolis. حَسْنٌ مَعْنَا auditus gravitas.

حَسْنٌ اهْرَمْ زَانْدْ ; id. حَسْنٌ اهْرَمْ dysuria.

حَسْنٌ difficultas, angustiæ; durities; spina.

حَسْنٌ asperitas; مُهَمَّةٌ وَمُهَمَّةٌ ægrotorum molestiæ.

حَسْنٌ, st. abs. c. nom.

fem. usurp., ar. عشر, heb. שָׁנָה, emph. حَسْنٌ c. nom masc., ar. عشرة, heb. שְׁנָה, m., numer. cardinalis; adject., decem. حَسْنٌ حَسْنٌ وَحْسَنٌ decimus, decem virgines. حَسْنٌ قَوْمَنَا decem mandata, f. emph. et subst. حَسْنٌ دَعْرِيَا decuria, decas (dizaine), numerus decem; حَسْنٌ حَسْنٌ حَسْنٌ decima dies mensis; in st. est. s. حَسْنٌ; حَسْنٌ مَيْمَنَةٌ Decapolis; st. const. pl. حَسْنٌ; c. suff. مُهَمَّةٌ decem eorum; حَسْنٌ m., undecim. حَسْنٌ سَبْعَ حَسْنٌ discipuli undecim; f. سَبْعَ حَسْنٌ حَسْنٌ undecim anni. سَبْعَ حَسْنٌ بَعْتَ decuplum. سَبْعَ حَسْنٌ m., duodecim. سَبْعَ حَسْنٌ اَحْمَنَةٌ duodecim discipuli; m. emph. et subst. سَبْعَ حَسْنٌ duodecim, ol. δώδεκα (gall. les Douze); f. سَبْعَ اَحْمَنَةٌ : اَوْ اَحْمَنَةٌ duodecim anni. حَسْنٌ اَكْسَتْ dracunculus herba. حَسْنٌ مَنْتَ decachorda.

حَسْنٌ مَنْتَ مَنْتَ viginti.

dies viginti et unum; حُفَّمْ حُفَّمْ viceni.

Pa. حُفَّ *v. denom.*, decimam partem dedit *vel* sumpsit, *ar.* عَشَرَ.

Ethpa. حُفَّا لِdecimatus est. حُفَّا, *ar.* عَشَرُ, pars decima, decimæ (*gall.* dime).

حُفَّمْ, حُفَّمْ, *f. emph.* حُفَّمْ decimus. سِبْعَ حُفَّمْ undecimus; *f. emph.* سِبْعَ حُفَّمْ undecima, etc.

حُفَّمْ decas; *it.* mensura aridorum.

حُفَّمْ pars decima; *pl.* حُفَّمْ decimæ.

حُفَّمْ vigesimus.

حُفَّمْ numerus viginti.

حُفَّمْ pars decima.

حُفَّمْ ad decimas spectans.

حُفَّمْ decimarum exactio.

حُفَّا, *pl.* حُفَّا, *cfr.* حُفَّا, s. مَدْمَدْ, pinna muri, propugnaculum.

حُفَّا, *fut.* حُفَّا, *id. q.* حُفَّا, complevit, assecutus est; collegit, multiplicavit, *ar.* عَنْ; *intrans.* floruit. *Part. pass.* حُفَّا, *trop.* occupatus, *c.* ت.

Ethpe. حُفَّا لِoccupatus est. *Pa.* حُفَّ involvit; sepelivit.

لَا مَحْبَبٌ بِهِ كَمَدْفَنَهُ أَئْمَ eos inhumare non potuerunt.

Aph. حُفَّ germinavit, floruit; florere fecit.

حُفَّا flos, gramen; putredo. حُفَّا, *id. q.* حُفَّا; *it.* occupatio.

حُفَّا involutio; sepultura. حُفَّا sepeliens; ad sepulturam pertinens.

حُفَّا, *fut.* حُفَّ complicit, duplicavit *vestem*; multiplicavit; se multiplicavit; *cfr.* حُفَّا *et* حُفَّا. *Part. pass.*

حُفَّا, حُفَّا duplex; حُفَّا هَذِهِ Hexapla versio; *subst.* scripturæ genus; *f. emph.* *et subst.* حُفَّا diplois.

Ethpe. حُفَّا لِاحْفَافِهِ, *cfr.* اْحْفَافِهِ, duplicatus est.

Pa. حُفَّ duplicavit, iteravit, repetiit. حُفَّهُهُهُ duplo magis furati sunt.

Ethpa. حُفَّا لِاحْفَافِهِ pass. *et refl.* *Aph.* حُفَّا duplicavit.

Ettaph. حُفَّا لِpass. حُفَّا fornix; *adj. v. infra.* حُفَّا involutio, plicatio.

حُفَّا et اْحْفَافِهِ; حُفَّا duplum, duplex. حُفَّهُهُهُ decuplum.

plus quam septies crevit.
أَحْفَّا مَهْتَأْ وَامْكُمْ plu-
ries tantumdem.

حَفْنَاهُ dupliciter.

حَفْنَاهُ duplicatio.

حَفْنَاهُ، حَفْنَاهُ duplicatio, repetitio, multiplicatio.

حَفْنَاهُ duplicatio, repetitio; duplum.

حَفْنَاهُمْ multiplicatio.

حَفْنَاهُمْ duplicatio.

حَفَّ, fut. نُحَفِّهُ amplexus est; circumdedit; cfr. سَخْمًا et heb. סַחְמָה. Part. pass., active usurp. حَفَّهُ, بِ حَفَّهُ أَهْمًا; حَفَّهُ victoriā consecutus.

Pa. حَفَّ complexus est; trop. dolores suscepit.

Ethpa. حَفَّهُ id. q. Pa.; it. se mutuo amplexati sunt.

Aph. حَافَّهُ amplexari fecit.

حَفَّهُمْ et حَفَّهُمْ amplexus.

حَفَّهُمْ amplexens.

حَفَّهُمْ id.; mentum.

حَفَّ inus.; cfr. ar. حَفَّ obte-
xit.

Pa. حَفَّهُ texit; denom. v.
حَفَّهُ.

Ethpa. حَافَّهُ pass.; denom. v.
infra.

حَفَّهُ cucullus muliebris; cfr.
ar. غَنَارَة.

حَفَّهُ conopeum.

حَفَّهُ et مَدْهُونًا مَدْهُونًا, ar. مَغَرَّة, pal-
lium, superhumeral, pluvia-
le; cucullus, galea.

حَفَّهُ, حَفَّهُ, c. suff. حَفَّهُ, heb. حَفֵّ, ar. عَفَر et عَبَار, غبار
pulvis, terra.

Pa. حَفَّهُ denom., in pulverem
redegit, ar. غَرَّ; triticum in
area collegit.

Ethpa. حَافَّهُ in pulverem re-
dactus est, terrenus factus
est.

حَفَّهُ pulvis.

حَفَّهُ, حَفَّهُ purgamentum
areæ.

حَفَّهُ, حَفَّهُ ut seq.

حَفَّهُ terreus; pulverulentus.

حَفَّهُمْ immutatio rei in pul-
verem.

حَفَّهُمْ terrenus.

حَفَّهُمْ colligens pulverem;
aream expurgans.

حَرَّا, fut. نُحَرِّا ursit, coegit,
repressit, oppressit, cfr. حَرَّ;
restitit, c. acc. vel حَرَّ; re-
pugnavit, rebellis fuit, ar.

عَصَى . Part. act. حُمْرًا ; حُمْرًا , حُمْرًا ; حُمْرًا لِمَا نَعْصَى animam meam cogo : mihi vim infero. مُهْمَدَسْ cogere potest ; حُمْرًا ۝ ۝ ۝ ne cogant. Part. pass. حُمْرًا , حُمْرًا .

Ethpe. حُمْرًا لِمَا نَعْصَى pass. ; لِمَا حُمْرًا دُنْعَى coactus est ; it. restitit, repugnavit.

Pa. حُمْرًا restitit, rebellis fuit ; evulsit. دُمْدَمًا لِمَ حُمْرًا quantumvis repugnet.

Ethpa. حُمْرًا لِمَا نَعْصَى coactus est, oppressus est ; restitit.

Aph. حُمْرًا restitit.

حُمْتَنَا contentio ; coactio, vis ; حُمْتَنَا coacte ; وَلَا حُمْرًا sponte ; it. gramm. nomen interpunctionis.

حُمْتَنَا coacte, invite.

حُمْتَنَا pervicacia, rebellio.

حُمْتَنَا contentiosus, rebellis.

حُمْرًا oppressor.

حُمْتَنَا ut حُمْتَنَا .

حُمْتَنَا contumacia, rebellio.

حُمْرًا coactio ; resistentia.

حُمْتَنَا eluctabilis.

حُمْتَنَا coactio, vexatio.

حُمْرَتْ , ar. عَصَبَ , fut. حُمْرَتْ obligavit vulnus ; per extens. reparavit navem ; trop. sanavit animi angores : حُمْرَتْ

كَعْشَمَا وَمَعْنَمَا كَ obliga plagam quæ me sauciavit.

Ethpe. لِمَا نَعْصَى pass.

Pa. حُمْرَتْ ut Pe.

حُمْرَاتْ ligatura vulneris ; emplastrum, medicamentum, medicamenti paratio.

حُمْدَمَا fascia capitis, ar. عَصَابَة .

حُمْدَمَا alligator vulneris, chirurgus, medicus.

حُمْدَمَا vulneris seu fracturæ sanatio.

حُمْرَقَةْ , ar. عَصْفَرْ , flores carthami.

حُمْرَ , fut. نَكْعَرْ compressit, ar. عَصَبَ obduruit. Part. pass. حُمْرَاً ; ap. gramm. vocali (﴿ vel ﴾) insignita littera.

Pa. حُمْرَ ursit, coegit, ar. عَصَصَ ; ap. gramm. litteram vocali (﴿) notavit.

حُمْرَا vocalis (﴿) syriaca.

حُمْرَةْ instructio litteræ vocali (﴿).

حُمْرَةْ pisum.

حُمْرَ heb. עַצְר , ar. عَصَرَ , fut. حُمْرَهْ pressit, expressit, calcavit uvas etc. ; trop. coegit, domuit, oppressit.

Ethpe. حُمْرَا لِ pass.

Pa. حُمْرَهْ ut Pe.

Ethpa. حُمَّةٌ pass.

حُمُّةٌ expressio, conculeatio; quod exprimitur, succus, ar.

حُمُّةٌ بِأَوْهَمْتَأْ عِصَارَةٌ ptisana.

حُمُّةٌ amylum (*gall. amidon*). حُمُّةٌ وَلَمْ حَصْمَدْتَأْ oleum endivii. حُمُّةٌ بِمَتْكَأْ acacia arbor *vel* succus ejus.

حُمُّةٌ calcator; oppressor; paropsis, ar. غَضَارَةٌ.

حُمُّةٌ expressio succi.

حُمُّةٌ exsuctio, expressio succi, vinaceum; nucleus.

حُمُّةٌ , heb. נְדָרָה , pl. coetus solemnis ad sacrificia.

حُمُّةٌ , ar. مَفْسَرٌ et مَفْسَرَةٌ , pl. مَفْسَرَاتٍ مَفْسُورٌ , مَفْسُورَاتٍ torcular.

حُمُّلٌ , fut. نَحْمَلٌ retorsit, superpinavit.

Ethpe. حُمَّدٌ et *Ethpa.* حُمَّةٌ pass.

حُمُّلٌ inversio, retorsio.

حُمُّلٌ torques, v. s. حُمَّلٌ .

حُمُّدٌ , fut. نَحْمَدَتْ , heb.

نَحْمَدَتْ , ar. عَقِبٌ , calcem tenuit, inde retinuit, proxime exceptit; secutus est, vestigiis

instiit, profectus est. حُمَّدٌ diligenter investigans.

حُمَّدٌ سَلَوةٌ وَفَتْنَةٌ suam naturalem libertatem assecutus est.

Pa. حُمَّدٌ indagavit, investigavit, visitavit; interroga-

vit, quæsivit, c. حُمَّدٌ vel حُمَّدٌ ;

disputavit, disceptavit, c. حُمَّدٌ pers. ; it. ut *Pe.* calce tenuit.

Ethpa. لَا مَدْحَدَةٌ pass.;

اَكْتَاهَا مَدْحَدَةٌ حَذَّلَتْ Deus investigationi hominum impervius est.

Aph. حُمَّدٌ investigavit.

حُمَّدَأْ , f., pl. حُمَّدَأْ , it. حُمَّدَأْ

pl. حُمَّدَأْ , heb. حُمَّدَأْ , ar.

عَقِبٌ , calx; vestigium; pars ima rei, radix montis; trop.

finis, extremitas; oratio finalis in liturgia; gramm., terminatio. حُمَّدَأْ وَمَدْهَدَهٌ extremitas baculi.

اَسْبَتْ حُمَّدَأْ vestigia ejus apprehendit: eum secutus est, imitatus est.

حُمَّدَهٌ post eum.

اَسْبَتْ حُمَّدَهٌ retrogressus est.

حُمَّدَهٌ subsecutio, successio; it.

ut حُمَّدَهٌ .

حُمَّدَهٌ investigatio, examen.

حُمَّدَهٌ supplantatio; dolus.

حُمَّدَهٌ investigator.

حُمَّدَهٌ inquisitio; successio.

حُمَّدَهٌ diligenter investigans.

حُمَّدَهٌ sera investigatio.

حُمَّدَهٌ et حُمَّدَهٌ curiose.

حُمَّدَهٌ , f., حُمَّدَهٌ , pl.

مُدْعِيٌّ, f. **مُدْعِيَةٌ** scruta-
tor, inquisitor.

مُنْهَدِّفٌ *inquisitus.*

الْمُسْتَهْدِفُ quæstio.

حَمْدَهُ qui investigari potest;
c. **حَمْدَهُ**, investigabilis.

مُهْمَّةً adverb. ; c. præc. **نِ**,
incomprehensibiliter.

مَدْحُونٌ disquisitio, investigabilitas.

الْمُعَصِّلُونَ f., mus, musculus,
pl. الْمُعَصِّلَاتُ.

تُوك, *heb.* תָקַע, *ar.* تَوَكَّد
fut. **تُحْمِمُ**, *torsit, contexit.*

Part. pass. حَمِّلٌ; ap. Al-chim., corpus fixum.

Pau. **مَوْدَع** contorsit, revolvit.

Ethpan. اَنْجَوْمٌ pass. et refl.;
trop. perplexus fuit; curis,
morbo exagitatus est.

حَمْرَةٌ, ar. **حَمْرَةٌ**, ap. Alchim.,
*corporis liquidi seu volatilis
stabilitas.*

جَمْبَرًا et جَمْبَرًا plica, flexio,
implicatio; spira serpentina.

حَمْبَّاً وَمَهْتَأ tormina, viscerum dolor, colica.

וְאַ, *inus.*; *cfr. heb.* עֲקָר, *ar.* عَكْلَةٌ *erura distorta habuit,* *et* عَكْلَةٌ *implicavit, ligavit.*

Part. pass. ﴿مَحْتَلٌ﴾, f.

contortus; innodatus; pravus. مَنْدَدٌ مَنْدَدٌ؛ وَسَلَدٌ مَنْدَدٌ religio perversa.

Ethpalp. **وَهْدَلِي** pass.

Parel ﴿نَفَّ﴾ implicavit, intor-
sit, ar. عَرْقَلَ id.

Ethpar. ﻷا ﺡَنْ ﻡُكَبِّلٌ pass. ; trop. confusus fuit sermo. ﻷا ﺡَنْ ﻡُكَبِّلٌ superbi fumo convolventur.

viscerum dolor.

جَهْلٌ et **جَهْنَمٌ** flexus, tortuosi-
tas.

حَمْلَمَةٌ, *heb.* חַמְלָמָה, *tortuous*: *prop.* perverse.

تُرْتُوِزَةٌ tortoise.

مَدْمَدَةٌ incurvatio, contorsio.
حَنْكَلَةٌ œsypum (*gall.* graisse de
 laine).

نَمْلَةٌ supplantatio ; complicatio.

جَهْوَمُ tortus; *trop.* confusio.
مَحْمَلٌ, ar. عَقَالٌ et مَفْعَلٌ, vincu-

لُمْ ; *pedum pastorale*.
لُمْ سَعْدَانْ *supplantans*.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ irretitu facilis.

الْمُكْتَنَسْ implicatio, confusio.

حَمْضٌ *inus. in Pe.*

Pa. حَمْضٌ torsit, tortuosum fecit; *trop.* pervertit; perversitate convictit; *cfr. chald.*
Pi. v. حَمْضٌ *id. Part. pass.* حَمْضٌ, مَكْتَنَسْ ;
adj. obliquus; *trop.* perversus.

Ethpa. حَمْضٌ *pass.*; inique se gessit; fraudulenter egit.
 حَمْضٌ, حَمْضٌ, حَمْضٌ litteræ implicantæ in gutture: gutturales litteræ.

حَمْضٌ complicatio, contorsio; astutia; perversitas.

حَمْضٌ tortus; perversus.

حَمْضٌ tortuositas; astutia, calliditas.

حَمْضٌ dolus.

حَمْضٌ perverse.

حَمْضٌ distorsio; perversitas.

حَمْضٌ distorquens; perversens.

حَمْضٌ perversitas; dolus.

حَمْضٌ, usit. in part. pass.;
cfr. ar. عَكْش implexus fuit et عَصْر innexuit crines. حَمْضٌ

حَمْضٌ tortus, curvatus;
cfr. شَرْب id.

Ethpe. حَمْضٌ punctus est.

Pa. حَمْضٌ inflexum erexit ramum. *Part. pass.* حَمْضٌ, مَكْتَنَسْ ; perversus.

Ethpa. حَمْضٌ punctus est.

حَمْضٌ, pl. حَمْضٌ aculeus; stimulus, stimulatio; angor animi, stimulus conscientie; incitamenta.

حَمْضٌ punctio; *trop.* injuria.

حَمْضٌ clavis.

حَمْضٌ curvatio, distorsio.

حَمْضٌ squilla marina.

حَمْضٌ et حَمْضٌ crispus.

حَمْضٌ crispitudo erinum.

حَمْضٌ obliquus, tortus.

حَمْزٌ, heb. حَمْزٌ, ar. عَقَرْ, fut. حَمْزٌ eradicavit, extirpavit, eruit; diruit, evertit; *intrans. ar.* عَقَرْ, sterilis factus est. *Part. act.* حَمْزٌ, حَمْزٌ; حَمْزٌ fraudator (gall. arracheur de dents). *Part. pass.* حَمْزٌ, حَمْزٌ destructus; dilaceratus.

Ethpe. حَمْزٌ *pass.*

Pa. حَمْزٌ penitus evulsit, funditus evertit.

Ethpa. حَمْزٌ *pass.*

Aph. حَمْزٌ sterilem fecit Deus.

حُمَّة	eradicatio.	حُمَّة	ar. عَفْرَب, scorpio ; وَهُوَ
حُمَّة	eradicatio, eversio.	حُمَّة	testudo.
حُمَّة	exstirpator, evensor.	حُمَّة	rana.
حُمَّة	, f. emph. حُمَّة, pl. حُمَّات	حُمَّة	calcitratio.
حُمَّة	, heb. עַקְר et ar. عَاقِر, impotens.	حُمَّة	calcitrosus.
حُمَّة	sterilis ; impotens.	حُمَّة	et حُمَّة motus libidinis.
حُمَّة	id.	حُمَّة	عَرَابا et حُمَّة, cfr. ar. su-
حُمَّة	sterilitas.	حُمَّة	pervenit, fut. حُمَّة comprehen-
حُمَّة	evulsio.	حُمَّة	dit, cepit, tenuit ; accepit,
حُمَّة	phillyrea, pro حُمَّة q. v.	حُمَّة	excepit ; trop. mente perce-
حُمَّة	exstirpator.	حُمَّة	pit, c. حُمَّة vel حُمَّة ; it. intr.
حُمَّة	, ar. عُقْر, pl. حُمَّات radix, stirps ; planta medicina-	حُمَّة	deliquio correptus est. Part.
حُمَّة	lis ; per extens. ima pars rei ;	حُمَّة	pass. حُمَّة, f. حُمَّة, pl. حُمَّات
حُمَّة	trop. origo, principium.	حُمَّة	adj. frigidus.
حُمَّة	agri- حُمَّة وَحْشَة vel وَحْشَة	حُمَّة	Ethpe. حُمَّة pass. ; it. friguit.
حُمَّة	monia planta. حُمَّة وَأَوْدَه	حُمَّة	Pa. حُمَّة frigidum reddidit.
حُمَّة	radix granati sylvestris.	حُمَّة	Aph. حُمَّة cepit ; prandium
حُمَّة	orobanche planta. حُمَّة وَأَوْدَه	cepit.	
حُمَّة	androsacees planta. حُمَّة وَحْشَة	حُمَّة	prehensio ; epilepsy.
حُمَّة	radix aurea, seu	حُمَّة	prandium ; it. prehensio ;
حُمَّة	rubia tinctorum. حُمَّة وَمَهْمَة	tolerantia, patientia.	
حُمَّة	radix columbarum : species	حُمَّة	frigus, asperitas
حُمَّة	verbenæ. حُمَّة وَمَكْسَـا	frigoris ; ar. عَرَقَ ventus fri-	
حُمَّة	salis fodina. حُمَّة وَحْشَة	gidus.	
حُمَّة	ager fluvialis. حُمَّة et حُمَّة دَهْنَـا	حُمَّة et حُمَّة frigidus.	
حُمَّة	paeonia planta (gall. pivoine). حُمَّة وَهَوْلَـا vel	حُمَّة et حُمَّة tremor febri-	
حُمَّة	pyrethrum. حُمَّة وَهَـ	lis, ar. عَرْقَا.	
حُمَّة	chelidonium planta ;	حُمَّة	acus textoria.
حُمَّة	radix croci.	حُمَّة	adverb. nude, cfr. ar.
حُمَّة	eradicandus.	et Pi. v. heb. شَرَه, nudus fuit.	
حُمَّة	, pl. حُمَّات, heb. נִקְרָב	حُمَّة	nuditas.

جَنْت denudatio.

جَنْت, v. s. .

جَنْتَمْلَ comprehensibilis.

جَنْتَمْلَ frigus; it. sarmenta, quisquiliae.

جَنْت, ar. غَرَب, fut. intrans. occidit sol, luna, stella, etc.; act. ar. عَرَب, fut. جَنْتَهُ spopondit; sponsor fuit in Baptismo; cfr. heb. זָהָב in utroque sensu; it. cibravit, cfr. جَنْخَل; it. miscuit. جَنْدَمْلَ ne immergatur anima tua in peccatis. Part. præt. et pass. جَنْتَهُ occiduus sol; permixtus; cibratus.

Ethpe. أَجَنْت pass.; commixtus est; sponsor factus est.

Pa. جَنْت occidere fecit Deus solem; immiscuit.

Aph. تَجَنْدَهُ ad occasum perduxit solem; occultavit.

جَنْدَهُ occasus.

جَنْهَدَهُ sponsor.

جَنْهَدَهُ, heb. שְׁמַרְתָּה, ar. عَرْوَةَ vespera sabbati, feria sexta; cfr. neo-heb. שְׁמַרְתָּה dies quo fit mixtio ad præparacionem sabbati. جَنْهَدَهُ, vel تَجَنْهَدَهُ feria sexta. جَنْهَدَهُ وَمَسْكَهُ et مَسْكَهُ

vel جَنْهَدَهُ مَبْرُومَهُ it.

جَنْهَدَهُ feria sexta in Parasseve.

جَنْهَدَهُ وَمَهْبَهُهُ et مَهْبَهُهُهُ feria sexta post dominicam in albis.

جَنْهَدَهُ بَعْدَهُهُ feria sexta quæ sequitur octavam Pentecostes.

جَنْهَدَهُ fidejussio; cibratio.

جَنْهَدَهُ, ar. غَرَب, vas ligneum cavatum, mactra.

جَنْهَدَهُ, pl. جَنْهَدَهُ, heb.

شَجَرَهُ, salix arbor; cicer; regio occidentalis, occidens, ar. غَرَب: asparagus; rota aquaria. رَبْوَهُهُهُ جَنْهَدَهُهُهُ rhododendron.

جَنْهَدَهُ sponsor, inde patrinus in Baptismo, ar. عَرَاب.

جَنْهَدَهُ sponsio, fidejussio; pinguis.

جَنْهَدَهُ id; cfr. ar. عَرْبَون.

جَهْدَهُ commixtio.

جَهْدَهُ commixta turba; coluvies insectorum.

جَهْدَهُ e., ovis.

جَهْدَهُ ovinus.

جَهْدَهُ, heb. זָהָב, ar. غَرَاب, corvus; pl. جَهْدَهُهُ et جَهْدَهُهُهُ corvinus.

جَهْدَهُ, heb. شَرْدَهُ, desertum, spec. quod inter mare Mereum et sinum AElaniticum excurrit.

حَنْدَّاً arabs, arabicus.

حَنْدَةً occidens, occidentalis ;
subst., heb. מִשְׁרָבָה , ar. مَغْرِبٌ ,
occidental regio.

حَنْدَّاً , pl. مَحْنَدَّاً , pler. in st.
est. مَحْنَدَّسٌ , occasus solis,
etc. ; it. regio occidentalis.

حَنْدَةً occidentalis; f. et subst.
مَحْنَدَّةً occidentalis ventus.

حَنْدَةً turba promiscua.

حَنْدَةً commixtio ; cribratio.

حَنْدَةً palumba, turtur.

حَنْدَةً centaurium planta.

حَنْدَةً , ar. غَزِيلٌ , cibravit,
cfr. حَنْدَةً .

حَنْدَلٌ cibrum.

حَنْدَلٌ cibratio.

حَنْدَةً , v. s. حَنْدَةً .

حَنْدَةً usitat. tant. in formis
deriv. cfr. ar. عَرَدٌ corrosit.

Palel حَنْدَةً erosit ossa.

Ethpal. أَنْتَنَدَةً pass. ; it. ut
Palel.

حَنْدَةً et حَنْدَةً erosio ossium.

حَنْدَةً , al. حَنْدَةً , ar. غَرَدٌ , tuber
terræ.

حَنْدَةً , pl. malus navis ;
trabs, clavus ligneus, cfr.
حَنْدَةً ; columna; onager, heb.

حَنْدَةً , ar. عَزَادٌ ; it. tormentum
bellicum, aries, ar. عَزَادَةً .

حَنْدَةً , pl. حَنْدَوْلًا onager.

Ethpa. أَنْتَنَدَةً v. denom., ut
onager efferatus est.

حَنْدَلَةً effrenatio morum.

حَنْدَلَةً et حَنْدَلَةً , id. q.
prae.

حَنْدَلَةً libidinosus, salax.

حَنْدَةً , v. s. حَنْدَةً .

حَنْدَةً inus. ; ar. ضَرَطٌ , crepitum
ventris emisit.

حَنْدَةً et حَنْدَلَةً crepitus ven-
tris.

حَنْدَلَةً ↑ vestibus exuit, nu-
davit, spoliavit, forma Pa-
rel rad., حَنْدَلَةً , ar. عَطَنْ nudus,
vacuus fuit.

Ethpar. حَنْدَلَةً pass. ; caruit.
حَنْدَلَةً denudatio.

حَنْدَلَةً nudus, indecl. c. omni
genere et numero حَنْدَلَةً ambulavit Isaias nu-
dus et discalceatus ; adverb.
nude ; trop. unice, mere. حَنْدَلَةً

Deus purus.

حَنْدَلَةً , f. emph. حَنْدَلَةً , f.
pl. حَنْدَلَاتٍ , f. حَنْدَلَةً nudus ; trop. sim-
plex, merus. حَنْدَلَةً مُّ أَسْلَى vel
absol. حَنْدَلَةً inermis.

حَنْدَلَةً nude, simpliciter.

حَنْدَلَةً nuditas ; pudenda.

جَنَّةٌ et جَنَّةً cyclaminis species (gall. oreille de lièvre).
جَنَّةٌ et جَنَّةً leontopetalon planta.

جَنَّةٌ, fut. جَنَّةً, ar. عَرَكْ, heb. גָּרַעַ, subegit farinam, depuit; fricuit.
جَنَّةٌ et جَنَّةً subactio farnæ; frictio.

جَنَّةٌ, emph. جَنَّةً, pl. جَنَّاتٍ, incircumcisus; inde gentilis, profanus; cfr. heb. גָּרַעַ et ar. جَنَّةٌ præputiatus fuit. جَنَّةٌ وَجَنَّةٌ aures eorum incircumcisæ sunt: corde obdurate sunt.

جَنَّةٌ id.

جَنَّةٌ, pl. جَنَّاتٍ præputium, incircumeisio; trop. gentilismus.

جَنَّةٌ, fut. جَنَّةً coacervatus est, cfr. ar. اَرْمَمْ eminencia, culmen. Part. pass. جَنَّةٌ, pl. جَنَّاتٍ altus; it. heb. גָּרַעַ, expertus, prudens, astutus; in pl. sapiens, consiliarius.

Ethpe. جَنَّةً astutus, peritus factus est.

Pa. جَنَّةً astutum, prudentem

effecit; tumescere fecit; trop. exacerbavit. Part. pass. مَجْنُونًا, مَجْنُونٌ; tumidus.

Ethpa. جَنَّةً coacervatus est, intumuit; trop. in aliquem exacerbatus est, c. ت; it. ut Ethpe.

جَنَّةٌ arduus; subst. locus elatus, cumulus, collis; nubes densa; vas olei, torcular.

جَنَّةً, pl. جَنَّاتٍ, ar. عَزْقَةً, cumulus tritici, lapidum; sphæra, fornix.

جَنَّةً asperitas loci, inclemencia tempestatis.

جَنَّةً astute; prudenter.

جَنَّةً astutia, malignitas; prudentia.

جَنَّةٌ arduus.

جَنَّةً maligne.

جَنَّةً intumescentia; malignitas.

جَنَّةً tumidus.

جَنَّةً inus. Part. pass. مَجْنُونٌ pollutus.

جَنَّةً, f. جَنَّةً durus; pervicax.

Ethpa. جَنَّةً denom. a præc., durus factus est.

جَنَّةً, f. جَنَّةً ut جَنَّةً.

جَنَاحَاتٍ durities, asperitas.

جَهْوَنَّمُ frons; calvities.

كُنْتَ مَهْمَلًا , pl. كُنْتُمْهَمْلَةً dim.,
lectulus.

ଓନ୍ତା, fut. **ଓନ୍ତନ୍ତି** id. q.
usitatus seq.

Pa. حَفْ , *ar.* صَرْفٌ , commuta-
vit, spec. pecuniam.

قُنْتَهُ nummus, moneta, spec. minuta ; lucrum.

Parel  , v. den., nummos obtulit.

السادسة، *pro sexta*, feria sexta.

سَلِيقٌ salix arbor; cfr. سَلِيقٌ et ar. ضَرِيفٌ.

مَحْفُظٌ, *ar.* مُصَرِّف, nummularius.

مَدْنَقْلَى argentariis proprium.

حَتْفَلٌ, **حَنْفَلٌ**, **f.**, *pl. حَتَّفَلَاتٌ*, caligo, nebula densa; *cfr. heb. חַנְפָלָה*, *Parel. v. inusit.* עֲנָבֶל, et ar. عَقْلَةٌ texit, velavit. **حَتَّسٌ حَتَّسَفَا** *densæ tenebrarum caligines.*

Ethpa. ﻭَفَّالِ v. denom., ca-

ligine, nebula obscuratus est;

it. volutavit se jumentum.

كَلْمَةٌ caliginosus, nebulosus.
فَلْمَةٌ volutatio jumenti.

חָנֵן, ar. عَرَضَ, fut. חָנֵן oc-
currit, supervenit; irruit in,
c. חָנֵן, heb. חָנֵן terruit; con-
tigit. Part. pass. חָנֵן; emph.
et subst. חָנֵן hospes occur-
rens, advena. Part. præt;

contingens.
urgens, necessarius; pl. f.
casus fortuitus.

حَذَرًا, it. حَذَرَهُ اِنْتَ neces-
sitas; adv. حَذَرَهُ necessario.
حَذَرَهُ casu, temere.

حَمْوَامٌ *id.*; coacte, necessario.
حَمْوَةٌ *edulii* species, frustum

carnis; cfr. ar. عَرْضَةٌ, caro
recens, et لِجْنَةٌ.

حَسْنٌ casus improvisus, accidentis, ar. عَارِضَةٌ.

Logia necessitas; hospitis adventus.

فَتَّ, fut. **فَتَّهُ**, imp. pl. **فَتَّهُوْهُ**, fugit, effugit, c. **فِتْهُ** ;
فَتَّهُ c. explet. **فَتَّهُ** id. ; pro-
fugit, configuit, c. **فِتْهُ** ; tremuit,
abhorruit. Part. præs. **فَتَّهُ**
fugiens. Part. præt. **فَتَّهُ**
fugitivus, profugus ; erosus.

Ethpe. اَجْهَمْ evitatus est.

Pa. كَجْمَعْ fugavit; corrosit, ar. عَرَقْ.

Aph. اَجْهَمْ in fugam convertit, fugavit, fugere jussit; liberavit; abegit, abstulit. *Part. act.* مَجْهُومْ ; *emph. et subst.* اَجْهَمْ refugium; effugium. اَجْهَمْ مَجْهُومْ locus refugii, asylum.

جَهْمُونْ , c. suff. حَنْفَهْ مَهْمَنْ , حَنْفَهْ مَهْمَنْ , fuga, declinatio; effugium, subterfugium. مَيْهَمْ مَهْمَنْ manum dederunt fugæ: terga verterunt.

جَهْمَهْ fugax; argentum vivum. جَهْمَهْ erosio.

جَهْمَهْ sordes dentium, aurum etc.

مَهْمَهْ كَجْمَعْ fugitivus. كَجْمَعْ fugæ se dederat.

كَجْمَعْ , pl. كَجْمَعْ et emph. حَنْفَهْ , pl. حَنْفَهْ , ar. عَزْقَةْ , lorum, vinctura; fascia; corrigia calceamenti; أَسْبَبْ حَنْفَهْ habenas tenens; auctoritatem exercens; it. frenum; zona; trop. zona coelestis; it. contignatio domus; cincinati, id. q. حَبْجَمْ , it. phillyrea, abies, juniperus, al. cedrus.

كَجْمَعْ juniperus, al. cedrinus.

مَهْدَنْ مَهْدَنْ fugator.

مَهْدَنْ مَهْدَنْ fugiendus; præc. عَلَى , ineluctabilis.

أَلَّا مَهْدَنْ مَهْدَنْ مَهْدَنْ adv. ; مَهْدَنْ مَهْدَنْ مَهْدَنْ ineluctabiliter.

مَهْدَنْ مَهْدَنْ مَهْدَنْ effugium.

كَجْمَعْ , vox ar. عَزْقَوبْ , tendo Achillis; cavum genu.

جَهْمَهْ videlicet .

جَهْمَهْ , fut. تَكْهَمْ molestatus est, tæduit; it. balatum vel mugitum edidit, ar. عَلَى mu-giit.

Palp. كَجْمَعْ , ar. غَرْغَرْ , abluit, gargarizavit.

جَهْمَهْ , ar. عَارِنْ , myrica, tamaris; كَجْمَعْ سَهْوَا agnus castus, vitex;

جَهْمَهْ دَهْنْ وَنْدَهْ indigo planta.

جَهْمَهْ نُوبَهْ nubes, caligo, procella.

جَهْمَهْ وَهْدَهْ procella; manna.

جَهْمَهْ لَوْهَهْ lotio dentium, gargarismus.

جَهْمَهْ signum elatum; malus navis, cfr. حَنْفَهْ .

جَهْمَهْ , heb. حَرَّهْ , ar. ضَرْهْ , pl. حَنْفَهْ et حَنْفَهْ cosponsa; concubina.

مَهْمَنْ , emph. حَنْفَهْ , st. c. لَهْمَهْ , pl. مَهْمَنْ caverna, spelunca; cfr. عَرْيَةْ rima, et مَهْمَنْ , caverna; it. per extens. cella eremitæ, cœnobium.

ج *inus.* — *Pa.* جَنَّبَ saginavit.

Ethpa. جَنَّبَ pass.; denom. *a seq.*, ad instar dentis molaris durus factus est.

جَنَّمَ, ar. جَنِينْس, dens molaris; *adj.* pinguis.

جَنْجَدَ pinguedo.

جَحْسَنَ, جَحْسَنَ cos; *trop.* ardor, aestus.

جَعَلَ, ar. جَعَلَ, fut. جَعَلَهُ oppressit, vi adegit, domuit.

Ethpe. جَاعَلَ pass.

Ethpa. جَاعَلَ vi adactus est.

جَعْمَانَ oppressio, afflictio, coactio.

جَعَلَ, fut. جَعَلَ invaluit, crevit, prævaluit *contra, seq.* مُنْهَى; gravis fuit; *seq.* مُنْهَى comparativi, gravior fuit; pervicax fuit.

Ethpe. جَاعَلَ prævaluit.

Pa. جَعَلَ roboravit, exaltavit; obduravit *cor*; prævalere fecit *contra, c.* مُنْهَى. *Part. pass.* مَعْجَلَةً, مَعْجَلَةً gravis, fortis.

Ethpa. جَاعَلَ pass. et refl.; summis viribus nesus est,

fortiter egit, fortem se præstitit; invasit, prævaluit *c.* مُنْهَى vel مُنْهَى.

Aph. جَعَلَ roboravit, induravit, aggravavit, auxit; refecit murum.

جَعْلَةً robur, munimentum; magnitudo, copia, abundatia. مَتَّجَنَّا وَجَعْلَةً prata luxuriantia.

جَعْلَانَ, جَعْلَانَ robustus, fortis, gravis; magnus, copiosus.

جَعْلَانَ حَمْلَةً periniquus.

جَعْلَانَ حَمْلَةً ingens clamor.

جَعْلَانَ حَمْلَةً elata vox; *f. pl.* حَمْلَةً, gramm., litteræ fortes, per opp. *ad* حَمْلَةً وَجَعْلَةً molles.

جَعْلَانَةً fortiter, valde.

جَعْلَانَةً, vis robur; حَمْلَةً fortiter, præstanter.

جَعْلَانَةً مَعْجَلَةً adjutor, auxiliator.

جَعْلَانَةً مَعْجَلَةً roboratio, adjumentum; robur.

جَعْلَانَةً مَعْجَلَةً oppressio; robur.

جَعْلَانَةً purgatio segetum.

جَعْلَانَةً ascia, securis.

جَعْلَانَةً مَعْجَلَةً cum ascia, securis ope; clare, lucide.

جَعَلَ, heb. جَعَلَ, fut. جَعَلَهُ criminatus est; calumniatus est; pervertit, fecellit, op-

- pressit. *Part. pass.* حَمْفٌ ; حَمْفًا دَاهْوَسْهٰ perversus.
- Ethpe.* حَمْفٌ لِّ calumniis impenitus est ; torpuit.
- Pa.* حَمْفٌ valde detraxit, vehementer criminatus est ; superbivit.
- Ethpa.* حَمْفًا لِّ oppressus est.
- حَمْفًا calumnia, incusatio falsa.
- حَمْفٌ detractor, calumniator.
- حَمْفًا injuria.
- حَمْفًا calumnia.
- حَمْفًا detractio, calumnia.
- حَمْفًا perversitas ; injuria.
- حَمْفًا molestus.
- حَمْفًا injuria, calumnia.
- حَمْفًا calumniis impetus.
- حَمْفٌ , *id. q.* حَمْفٌ .
- حَمْفًا , *heb.* שָׁנָה , *ar.* عَشْرٌ , decima pars.
- حَمْفًا , *ar.* عَنَارٌ , publicanus.
- حَمْفًا officium publicani, decimatum exactio.
- حَمْفًا inus.; *cfr.* حَمْفًا , s. حَمْفٌ , et *ar.* عَنَّا insolens fuit.
- Ethpe.* حَمْفًا لِّ fraude usus est.
- Pa.* حَمْفٌ criminatus est, c. حَمْفٌ pers.
- حَمْفًا frauds ; oppressio.

- حَمْفٌ paratus est, *ar.* عَيْدٌ , usit. tantum in part. pass.
- adjective usurp. حَمْفٌ , pl. حَمْفٌ بَرٌ paratus, promptus ; futurus حَمْفًا وَ حَمْفٌ بَرٌ sæculum seu vita futura ; *ap. gramm.*, بَرٌ tempus futurum ; pl. f. ئَهْمَى حَمْفٌ futura. ئَهْمَى ئَهْمَى seq. fut., vel حَمْفٌ بَرٌ حَمْفٌ seq. infin. futurum est ut, oportet ; حَمْفٌ بَرٌ وَ حَمْفٌ بَرٌ jamjam ascensurus. مَهْمَى وَ حَمْفٌ بَرٌ وَ حَمْفٌ بَرٌ مُّهْمَى id quod ei facturus erat Dominus noster. بَرٌ حَمْفٌ بَرٌ وَ حَمْفٌ بَرٌ cum in eo essent ut eam (*urbem*) tradarent. مَهْمَى ئَهْمَى وَ حَمْفٌ بَرٌ حَمْفٌ ipse est Elias qui venturus est ; *adverb.* بَرٌ حَمْفٌ بَرٌ in futurum, in posterum, deinceps.
- Pa.* حَمْفٌ paravit, constituit ; fecit ut, incitavit, ursit ; *cfr.*
- Pi. v. inus.* نَهْمَى وَ حَمْفٌ بَرٌ كَ كُبَّ quæ tibi paravi.
- Ethpa.* حَمْفًا لِّ pass. et refl.
- حَمْفٌ بَرٌ prompte, expedite, libenter.
- حَمْفٌ بَرٌ præparatio, promptitudo ; res futura ; *apud gramm.*, tempus futurum.
- حَمْفٌ بَرٌ futurus.
- حَمْفٌ بَرٌ , حَمْفٌ بَرٌ præparatio ; pro-

positum, consilium ; insidia ; præfatio *libri*. حَمَّاْوِا دَمَّهَةٌ eo scilicet consilio ut cœnobium aedificarent. حَمَّاْوِا وَمَهْمَنْهُ res consultò facta.

مَدَّهُوْأَمَّهُ prompte.

مَدَّهُوْأَمَّهُ præparatio.

مَدَّهُوْأَمَّهُ qui præparat.

مَدَّهُوْأَمَّهُ promptitudo.

مَهْمَنْهُ لَّا incessus mollis, affectatus.

حَمَّهُ, heb. حَمَّهُ, ar. عَثَقَ, fut.

مَهْمَنْهُ senuit, vetus factus est ; vetustate consumptus est.

Aph. مَهْمَنْهُ ad vetustatem redigit, antiquavit ; it. obsoletus est, vetus factus est.

حَمَّامَهُ antiquitas, vetustas ; senectus, longævitas.

حَمَّامَهُ, pl. حَمَّامَهُ, f. حَمَّامَهُ vetus, antiquus ;

senex ; حَمَّامَهُ antiquus

sæculi : aeternus. حَمَّامَهُ بَعْدَهُمْ حَمَّامَهُ

et abs. حَمَّامَهُ Vetus Testamentum ; adv. c. حَمَّامَهُ, in antiquo tempore.

حَمَّامَهُ antiquitus ; more antiquo.

حَمَّامَهُ inveteratio, vetustas, senectus.

حَمَّامَهُ fimbria ; it. ut جَمْفَرٌ, cincinni.

حَمَّهُ, heb. נְשָׁר, dives fuit ; crevit, locupletatus est, datus est.

Aph. حَمَّهُ ditavit, multiplicavit ; seq. نَفَعَهُ se divitem simulavit.

حَمَّهُ abundantia.

حَمَّامَهُ divitiae, opulentia. حَمَّامَهُ dives.

حَمَّامَهُ ad divitias pertinens.

حَمَّامَهُ , حَمَّامَهُ dives, abundans ; eximius, حَمَّامَهُ دَارِبُرٌ liberalis.

حَمَّامَهُ abundantanter.

حَمَّامَهُ copia, abundantia.

حَمَّامَهُ مَدَّهُونَهُ ditans.

حَمَّهُ, cfr. حَمَّهُ, fut. حَمَّهُ fraude usus est. Part. pass. adject. usurp. حَمَّهُ fraudulentus.

Ethpa. لَكَاهُ ut Pe.

حَمَّهُ f., ar. عَثَقَ, fraus, iniquitas.

حَمَّهُ fraudulentus.

۹

¶ seu لـ littera decima septima Alphabeti. ﺵ scriptio abbreviata est vocis: فـ، وـ، هـ imperativus. *Ejus valor numeralis* est: ﺵ = 80; فـ = 800; ﻮـ = octagesimus, etc.

1º *Duplicem sonum & refertur :*
durum unum sicuti (p) latinum, et tunc ei punctum superimponitur : فَهُوَ (nāpeq), mollem alterum c. puncto infra notato, uti (f) latinum : وَجْهُ (nēfaq); qui sonus lenis nnq. o pronuntiatur apud Nestor., v. g. أَعْمَدْ expli- cavit, sit مَلِئْ, imo et sic nnq. scribitur, v. g. لَمَّا pro تَحْمَلْ anima.

2º Equivalat в heb. ס et ar.
ف : ﻒـ ﺔـ ﻪـ ؛ فـ torsit ; it.
respondet греч. lit. π et ρ :
فـ ﺔـ ؛ قـ مـلـ ، φـλـηـ ; it.
refert pers. : قـ مـلـ ، پـيلـ ،
ar. فـلـ ، elephas.

۳º *Commutatur c. ب، ن et ف*
v. gr. حَدَّا et قَدَّا pix; فَمَدَّا

planities, *heb.* חַמְתָּה, *ar.* حَمَّةٌ.

فُلَمْ , fut. (cætera flect-
tuntur ut لَام q. v.), decorus
fuit ; cfr. heb. הַפְלִי et ar. بَعْلِيَّ
splenduit. Part. præt. فَلَمْ ,
f. emph. فَلَمْا , in st.
c. vel in comp. فَلَمْا , pl. فَلَامْ ,
emph. فَلَامْتَ , st. est. فَلَاتْ , f.
فَلَامْتَ , emph. فَلَامْتَكُمْ , st. c.
c. litteris لَفَلَا : وَفَلَا , de-
cens, decorus, pulcher ; decet,
convenit. مَنْ فَلَامْتَهَا splendi-
da i. e. elegancia verba.
وَفَلَا μεγαλοπρεπής ,
magnifica gloria. مَنْ فَلَامْتَهَا
qui sole pulchrior
erat. وَفَلَا وَمَنْهَا sicut ei
convenit. كَامِبَتْسِ مَلَكَتْمَهْ
per te, o Fili Dei, sit et Patri tuo
digna gloria.

Pa. حَلَّ ornavit; *flexitur sicut حَلَّ*, q. v.

- Ethpa.* اِتْفَلِي pass. Part. اِتْفَلِي مَدَافِعًا et مَدَافِعًا .
- Aph.* اِتْفَلِي ut *Pa.*
- Ettaph.* اِتْفَلِي et rectius اِتْفَلِي pass.
- فَامْسَه et فَامْسَه pulchre, decenter.
- اِلْمَه, st. c. لَامْلَه, decor, gratia; id quod decet; adverb.
- اِكْمَه اِكْمَه ٰهُوَپَرَهَوَهُ, sicut Deo convenit.
- فَاهْنَه hyena.
- فَاهْنَه فَاهْنَه lux.
- اِنْدَهْنَه فَادْهَه lat. fabrica, armorum officina.
- اِنْجَهْنَه فَاجْهَه φαγέδαινα, cancer.
- اِنْجَهْنَه فَاجْهَه φογγός, fagus arbor; it. v. اِنْجَهْنَه .
- فَاهْنَه, v. فَاهْنَه .
- فَاهْنَه فَاهْنَه پεριπατετικοί, Peripatetici philosophi.
- فَاهْنَه فَاهْنَه, id. q. فَاهْنَه فَاهْنَه, παράρησις, libertas.
- فَاهْنَه فَاهْنَه παυωνία, paeonia *planta* (*gall.* pivoine).
- فَاهْنَه فَاهْنَه πεύκη, pinus.
- فَاهْنَه et فَاهْنَه πάτος, sordes ex palæstris collecta.
- فَاهْنَه ar. نَعَّة, anas, anser.
- فَاهْنَه فَاهْنَه πετεινόν, volatile.
- فَاهْنَه فَاهْنَه πατέρο, pater.
- فَاهْنَه فَاهْنَه stirps, græce πατριά.
- فَاهْنَه فَاهْنَه παιδεία, eruditio.
- فَاهْنَه فَاهْنَه παῖς, servus.
- فَاهْنَه فَاهْنَه πέπερι, piper.
- فَاهْنَه فَاهْنَه πάχος, densitas.
- فَاهْنَه فَاهْنَه φάλαγγες, phalanges, ordines.
- فَاهْنَه فَاهْنَه et فَاهْنَه φαλάγγιον, phalangium *aranea* (*gall.* tarentule).
- فَاهْنَه فَاهْنَه φαλαξίς, phalaris *planta*.
- فَاهْنَه فَاهْنَه παλίουρος, rhamnus *palurus* *planta*.
- فَاهْنَه فَاهْنَه παλιγγενεσία, regeneration.
- فَاهْنَه vox lat. pinnæ.
- فَاهْنَه et فَاهْنَه, فَاهْنَه πανακή, panaces *planta*.
- فَاهْنَه فَاهْنَه πανάκεια, panacea.
- فَاهْنَه فَاهْنَه πυστολά, pustula.
- فَاهْنَه فَاهْنَه πυντοπώλης, venditor omnimodarum rerum.
- فَاهْنَه فَاهْنَه πάντως, omnino.
- فَاهْنَه فَاهْنَه πυνσέληνος, plenilunium.
- فَاهْنَه فَاهْنَه πυγκράτιον, pancratium *planta*.
- فَاهْنَه فَاهْنَه πانثِرَا panthera.
- فَاهْنَه فَاهْنَه φάσσα, palumbus.
- فَاهْنَه v. فَاهْنَه .
- فَاهْنَه فَاهْنَه παστός, thalamus.
- فَاهْنَه فَاهْنَه φάσηλος, phaseolus *planta* (*gall.* haricot).

فَهْمَتْا , id. q. فَهْمَتْا .	فَهْمَتْا παράκλητος , consolator ; Paracletus.
فَاهْدَمْا πάσχα , Pascha.	فَاهْدَمْا φαρέτρα , pharetra.
فَاهْمَمْا , vox ar. قَاسِقَةَ , libidinosus.	فَاهْمَمْا , v. فَهْمَتْا .
فَاهْمَمْا et فَاهْمَمْا , فَاهْمَمْا .	فَاهْمَمْا παρεπίδημος , peregrinus.
فَاهْمَمْا πεπρωμένη , fatum.	فَاهْمَمْا πάρυγγος , humidus.
فَاهْمَمْا et فَاهْمَمْا balbutiens, blæsus.	فَاهْمَمْا παρωτίς , parotis, tumor glandularum.
فَاهْمَمْا balbuties.	فَاهْمَمْا παροξύτονος , accentus paroxytonus.
فَاهْمَمْا et فَاهْمَمْا φακός , lens, lentis.	فَاهْمَمْا παρωνυγία , pl. paronychia herba ; abscessus ad unguis radicem (gall. panaris).
فَاهْمَمْا et فَاهْمَمْا , v. s. فَاهْمَمْا .	فَاهْمَمْا παρώνυμος , derivatus a nomine.
فَاهْمَمْا παράβασις , transgressio.	فَاهْمَمْيَهْ Pharisaei.
فَاهْمَمْا παραβολή , parabola.	فَاهْمَمْيَهْ περιστερά , columba.
فَاهْمَمْا , id. q. فَاهْمَمْا .	فَاهْمَمْيَهْ et minus recte فَاهْمَمْيَهْ , extremitas, angulus, praesert. facialis, (a rad. فَاهْمَمْيَهْ , cfr. heb. חָסֵן , os, oris) ; per extens. facies, gena, frons, mystax ; pl. فَاهْمَمْيَهْ sumitur ab فَاهْمَمْيَهْ q. v. , et فَاهْمَمْيَهْ pili labii inferioris.
فَاهْمَمْيَهْ παράταξις , acies ordinata.	فَاهْمَمْيَهْ balsami arbor : cfr. حَدَّمَهْ .
فَاهْمَمْيَهْ παραλαλῶν , obtrectator.	فَاهْمَمْيَهْ et فَاهْمَمْيَهْ , heb. חַדְמָה , ar. حَدَّمَهْ , ficus insipida, immatura ; lausonia inermis planta, ar. حَنَّاءَ .
فَاهْمَمْيَهْ παράλυσις , paralysis.	
فَاهْمَمْيَهْ παράλυτος , tithymalus planta.	
فَاهْمَمْيَهْ παράτωμα , casus, delictum.	
فَاهْمَمْيَهْ παραπληγία , hemiplegia, apoplexia.	
فَاهْمَمْيَهْ παραφροσύνη , deliratio.	

L ^o - Pa. *L* oblectavit,
adulatus est.

Ethpa. ~~é~~ ^élî pass.

¶ oblectatio.

ἐπιγάστριον, pars ventris superior.

~~1-2~~ id. q. usitat. Pa.

Pa.  freno instruxit
equum; per extens. junxit
currum; trop. refrenavit,
cohibuit; gramm. vocali (v)
seu (v) litteram instru-
xit.

Ethpa. ἔθη pass.

فَرْجٌ، emph. فَرْجٌ، pl.
فَرْجَاتٌ frenum; trop. claus-
trum. فَرْجٌ، فَرْجٌ، فَرْجٌ
portae tuae pone claustra.
فَرْجٌ frenans.

فِمْ frenum; coercitio;
gramm. vocalis. (اً) apud
Nestorianos; scil. duo puncta
quorum unum supra, infra
alterum scribitur: v. g. مَحْدَى,
ما مَحْدَى, ita vocatur utpote
cohibet ne sonus (a) in (e) de-
flectat.

مَفْكِنْ *apud gramm.*, nomen
puncti ad distinctionem for-
marum inservientis; *v. g.*
مَفْكِنْ 3^a pers *f.*, ut distin-

guatur a ~~يَكُونُ~~ ^{يَكُونُ} *2^a pers. et*
~~يَكُونُ~~ *1^a pers.*

♋ πάγουρος, pagurus; cancer, signum Zodiaci.

~~و~~ inus., cfr. ~~و~~.

Ethpa. ~~مَلِي~~ impeditus est.

L^os et L^os^o impedimen-
tum.

~~lum~~ ^q impediens.

دُعْيَةً مَوْلَى invite.

فَجْل, raphanus sativus (*gall* radis).

p-19 usitat. in partic.

præs., ~~لَا~~ *decrecens*

decrecentia.

~~fractura~~ *fractura ossis.*

~~100~~ ⁴⁹ edentulus, dentibus pri-
vatus.

~~to~~ tumor, ulcer.

Líq et **L**íq vox lat., pagina
nus, rusticus.

*F*ix^o et *F*ix^o ruta planta

παιγνίδια, lusus.

וְהַיְתָה, heb. **וְהַיְתָה**, ar. **وَجَاءَ**, fut. **وَهُوَ يَأْتِي**, occurrit, evenit in, forte incidit, c. \hookrightarrow pers., loci vel rei; evenit ei res, infortunium, c. \hookrightarrow vel \bowtie pers.; adiit, congressus est, irruit

in, impetuit, contendit, c. ٦
 pers. **فَسْتِبُوا** inter se
 concurrerunt personæ vel
 res. Part. pass. **فَسْتِبَ**, cui
 obviam occurritur; im-
 pers. ٦ **فَسْتِبَ** invenit rem.
 Aph. **أَفْسَدَ** occurrere fecit;
 injectit. **أَفْسَدَ** ٦ **وَكَمْ** posuit in eo iniquitatem om-
 nium nostrum.

فَسْتِبَ, pl. **فَسْتِبَاتُ**, **فَسْتِبَاتُ** occur-
 sus, accessus, casus: aditus,
 aspectus; conventus, con-
 gressus; aggressio; gramm.,
 casus; concursus litterarum.
حَابُوا **فَسْتِبَاتُ** festum occursus:
 festum Purificationis. **سَسَ**
فَسْتِبَ accessu facilis homo.
فَسْتِبَاتُ comitas. **فَسْتِبَاتُ** congres-
 su difficultis.

فَسْتِبَاتُ occursens; casu incidens
 in librum.

فَسْتِبَ, **فَسْتِبَاتُ**, heb. **בְּשָׂרֶה**, cor-
 pus, cadaver; corpus vivum,
 caro; per antonom. **فَسْتِبَ**
 absol., vel **فَسْتِبَاتُ**, corpus
 vivum: sanctissima Eucha-
 ristia. **فَسْتِبَاتُ** **فَسْتِبَاتُ** corpus
 Domini: id. **فَسْتِبَاتُ** **فَسْتِبَاتُ** corpus
 mysticum: id. **فَسْتِبَاتُ** **فَسْتِبَاتُ**
 corpore indutus: incarnatus;
 adverbial. **فَسْتِبَاتُ** corporaliter.

Pa. **فَسْتِبَ** v. denom., corpore in-
 duit; incarnavit.

Ethpa. **فَسْتِبَاتُ** pass.

فَسْتِبَ, **فَسْتِبَاتُ**, it. **فَسْتِبَ** corpo-
 reus, carnalis; **فَسْتِبَاتُ** incor-
 poreus. **فَسْتِبَاتُ** soror
 germana; in pl. f. **فَسْتِبَاتُ** vel
فَسْتِبَاتُ res materiales.
فَسْتِبَاتُ corporaliter.

فَسْتِبَاتُ incarnatio; natura
 corporea vel natura carnalis;
 per extens., natura humana,
 humanitas Christi.

فَسْتِبَاتُ, f. **فَسْتِبَاتُ** durus, aridus,
 mucidus panis; trop. inhu-
 manus, corruptus.

فَسْتِبَاتُ ariditas, siccitas.

فَسْتِبَاتُ pudenda, podex.

فَسْتِبَاتُ, pl. **فَسْتِبَاتُ** tormentum,
 poena, judicium.

فَسْتِبَاتُ **فَسْتِبَاتُ** **فَسْتِبَاتُ** **فَسْتِبَاتُ** vel
فَسْتِبَاتُ, descriptio.

Palp. **فَسْتِبَاتُ** v. den., descrip-
 sit codicem, librum.

Ethpalp. **فَسْتِبَاتُ** pass.

فَسْتِبَاتُ, ut usitat. **فَسْتِبَاتُ**.

فَسْتِبَاتُ et **فَسْتِبَاتُ** error.

فَسْتِبَاتُ et **فَسْتِبَاتُ** error.

فَسْتِبَاتُ sindon, sudarium.

فَسْتِبَاتُ, **فَسْتِبَاتُ** et

فِيَلْكُسْ, f. اِلْكُسْ,
παιδαγωγός, paedagogus, ma-
gister puerorum.

ars paedagogica.
institutio puerorum.
educatio, disciplina.
et *podagra*, *podagra morbus*.
laborans.

٩ , fut. نَفَرَ , inf. مُنْفَرٌ , erravit, peccavit ; deflexit, a scopo aberravit, *absol. vel seq.* مُنْتَهِىٌ ; fugit, *c.* مُنْهَىٌ ; defecit, irrita fuit *res* ; supersedit *a*, perdidit *rem*, *c.* مُنْهَىٌ . Part. præs. act. فَلَوْا , et فَبَا . Part. præter. فَمَبَأْتُ errabundus, *cfr.* نَفَرَ et formam فَرْمَةٍ .

Palp. فَلْلَهُ errare fecit.

Ethpalp. قَبْلٌ deflexus est,
aversus est.

Aph. $\overleftarrow{\text{ف}}\text{ل}$ in errorem induxit,
avertit, *c.* $\overleftarrow{\text{ف}}$; *it.* aberravit.

لُوْجِيُّون error, aberratio ; defec-
tio virium.

أَوْنَّ errans, devius.

Logo error.

أَبْرَرْتُ aberratio a recto.

فَيْلَأُ, *id. q.* **אַפְתָּה**, *heb. אֲפָתָח*,
ephod, superhumeral, tuni-

ca; it., ut **լա՞զ**, frustum pa-
nis, ar. **լազ**.

فَبِمَدَا, pl. فَبِمَتَادا et قَبْتَادا
manica, brachiale; amictus.

فَدِعْ, fut. **فَدِعْ** fidit, scidit.
فَدَانْ f., heb. **נֶדֶן**, ar. **فَدَانْ**, juge-
rum; jugum boum; aratrum.

וְנִזְבַּח, chald. פָּרֵן, ar. فَدَعَ, fut. نُزِّبَ tutudit, vulneravit. **וְנִזְבַּח**, it. قَبْرَأْ et قَبْرَأْ con-tusio.

فُسْتِ fustis, clava; malleus;
bipennis; lapicidina, latomiæ.

فِمْ *et* **فِمْ** constrictio, strangu-
gatio.

فَنْدُقٌ , ar. قَوْمَانْ , taberna ; cfr. قَبَّهُ مَهْمَهْ et قَهْلَامَانْ .

فَهُوَ مَعْنَى cauponarius.

فَذًا, *id. q.* جُذًا dispersio; cfr.
ar. بَذَرَ dispersit.

فُرْجٌ panis, placenta ; panis.
فُرْجٌ vox italicica, pater.

قَبْوَمَةً, it. قَبْوَمَةً, pl. قَبَوْمَاتٍ tympanum.

حُمَّوْهَا lacerta; *it. al.* **فَكِيدِوْهَا** vultur.

فَيْمَا et **فَهُوَ**, **فَهُمْنَا**, **فَهُوَأُنْدَا**
 ποδήρης, vestis talaris ad

usu sacerd
[L. **ت**, v. s. **ت**].

لَوْج, fut. **لَوْجَنْ** vagus
 fuit, vagatus est, circumvagatus est, erravit; *per extens.*, permeavit; *trop.* fluctuata est mens; seductus est.
Part. præs. **لَوْجَنْ**, **مَلَوْجَنْ**; *f.*
emph. **أَلَوْجَنْ**. **Part. præt.**
لَوْجَنْ, **مَلَوْجَنْ**.

Aph. اهـ vagari coegit; in errorem induxit, seduxit.

lōnē, **lōnē** et **lōnē** vagatio,
circumvagatio; *trop.* evaga-
tio mentis, distractio; er-
ror.

لَمْكَ vagus, errans; subst.
لَمْكَنْكَ stellæ errantes, planetæ, meteora.

|Ləʊf̩| error.

אָוֶרֶב $\pi\chi\tilde{\nu}\acute{s}$, $\pi\chi\tilde{\nu}\delta x$, puer.

فَنْدَهُ، *ar.* فَنْدَهُ، panthera.

فَبِأَنْهُمْ لَا يَرْجِعُونَ, id. q. فَبِأَنْهُمْ لَا يَرْجِعُونَ, v.
s. ۱۹.

فَوْمَعٌ πεδίον, campus; it.
epilepsia.

σέπτον τέρας, saxum.
σέπτον τέρας πετρόσελινον,
petroselinum, apium graveo-
lens.

مَرْكَبٌ مَلْأَى فِي نَهْرٍ، mare.

¶**מַעֲנָה** פְּנֵי תְּלֵנָהּ, pelicanus.

ፋይና የዕለሳንያ፣ pænula.

وَهُوَ et commun. Pa. وَهُوَ
oscitavit: cfr. وَهُوَ.

Ethpa. ;ō̄L̄ id.

أُقْتَدُ oscitatio.

فَوْهَاتٍ *néoxas*, extremitas.

فُؤْدَةٌ وَمُحْنَفٌ παρεδίκιον, parieta-
ria planta.

περιτόναιον, peri-tonaeum.

فَهُوَ مُحْدَّثٌ περίγονος, region
adiacent.

وَمُهْلِكٌ وَمُهْلِكٌ نَبِيُّكُمْ وَرَبُّكُمْ، colum-
ba.

— abbr. *vocis* قُوْمُعْلَى, expli-
catio.

~~—~~ १०८, valeriana planta.

فُؤْلَمْعَ *qualitas.*

فَمَهْلَأ, it. فَمَهْلَأ, فَمَهْلَأ, f. فَمَهْلَأ, pl.
et فَمَهْلَأ, m. فَمَهْلَأ, فَمَهْلَأ, noyr. n.,
poeta.

فَهُمْ أَمْرٌ فِي poetics.

الْمَهْمَةُ فِي poesis.

فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ πολυγόνατον, polygonaton herba.
 فَهْكَمْهُنْمَ فَهْكَمْهُنْمَ πολύγονον, polygonum planta.
 فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ et فَهْكَمْهُمْلَامْ f., πολιτεία, imperium, res publica, provincia, civitas; فَهْكَمْهُمْلَامْ حَتَّ فَهْكَمْهُمْلَامْ concives; it. administratio status, politia. trop. ratio agendi, mores.
 فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ πολιτευόμενοι, magistratus.
 فَهْكَمْهُمْلَامْ et فَهْكَمْهُمْلَامْ politicus; administrator.
 فَهْكَمْهُمْلَامْ Politicorum liber a Platone editus.
 فَهْكَمْهُمْلَامْ πολιτικός, politicus, civilis.
 فَهْكَمْهُمْلَامْ πόλητος, puls.
 فَهْكَمْهُمْلَامْ لَارُوس, laurus.
 فَهْكَمْهُمْلَامْ pl. فَهْكَمْهُمْلَامْ πόλητος, polulus.
 فَهْكَمْهُمْلَامْ it. فَهْكَمْهُمْلَامْ et فَهْكَمْهُمْلَامْ πολύποντος, πολύποδος, polypus zoophyton; polypus morbus nasi.
 فَهْكَمْهُمْلَامْ πόλητον, teucrion, polium herba (gall. germandrée).
 فَهْكَمْهُمْلَامْ index, catalogus.

فَهْكَمْهُمْلَامْ pl. فَهْكَمْهُمْلَامْ abst.
 فَهْكَمْهُمْلَامْ ar. فَهْكَمْهُمْلَامْ (et c. pron. suff. فِي, فَأْ, cfr. heb. כִּי,

et infra لَفْ ; it. supra اِلَفْ os, oris, proboscis; per extens., orificium, superficies; bucea; trop. locutio; interpres. فَهْكَمْهُمْلَامْ اِصْفَا acies gladii. فَهْكَمْهُمْلَامْ os fætens: calumnia. فَهْكَمْهُمْلَامْ مِنْ ex ore; trop. secundum, juxta. مِنْ فَهْكَمْهُمْلَامْ ex verbis ejus; memoriter. مِنْ فَهْكَمْهُمْلَامْ ex ore; in superficie, super; juxta. مِنْ فَهْكَمْهُمْلَامْ ex ore regis: ex parte ejus. مِنْ فَهْكَمْهُمْلَامْ حَسْبَ فَهْكَمْهُمْلَامْ uno ore, unanimi consensu.
 فَهْكَمْهُمْلَامْ ar. فُوه, forma inus. vocis فَهْكَمْهُمْلَامْ usurpat. tantum more præposit. c. proep. مِنْ فَهْكَمْهُمْلَامْ juxta os; inde secundum, juxta, pro ratione. فَهْكَمْهُمْلَامْ وَ حَفْقَمْهُمْلَامْ propterea quod, scilicet quod. مِنْ فَهْكَمْهُمْلَامْ حَفْقَمْهُمْلَامْ robur ejus pro ratione corporis ejus est.
 Pa. فَهْكَمْهُمْلَامْ v. denom., pronuntiavit.
 Ethpa. مَفْهَلِي enuntiatus est.
 Palp. فَهْكَمْهُمْلَامْ enuntiavit.
 فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ ore tenus, verbatim.
 فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ tumores.
 فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ فَهْكَمْهُمْلَامْ πομφόλυξ, pompholyx, scoria.
 فَهْكَمْهُمْلَامْ v. s. فَهْكَمْهُمْلَامْ .
 فَهْكَمْهُمْلَامْ πόνος, labor.

فَهُنَّا et **فَهُنَّا** vox lat., funulus.

puellæ, cfr. **أَنْسَى**.

فَمَّا قُبْصَ، ar. فَمَّا، crepitus ventris (*gall. vesse*).

فَمَلْأَهُ *vox lat.*, fossatum,
castra fossis circumdata.

فَهْمَهْ πίσον, pisum; it.
πόσος, quantus.

فَهْمَهْمَةٌ , *pers.* بُوستين , *vestis*
 pellicea ; *cfr.* neo-ar. فَنْطَان .
 فَهْمَهْمَةٌ لِّعَصْمَانِ , *physiognomicus*.

فَهْسَةُكَهْ, *pl.* scientiæ naturales.

فَهُنَّا كُلُّهُمْ physiologici.

physiologia.
فِيَّا فَهُوَ مُهِمٌ f., φύσις, natura.

فَهُصْنَهْسَهْ οὐρανός, physicus,
in scientiis versatus.

فِي فُسْقَى *οἱ Φυσικοί*, Physici,
secta philosophica.

۷۵ *inus.* — *Pa.* ۷۶ *macera-*
vit, *cfr.* ۷۵.

فَنَّا maceratio; *cfr.* **فَ**; *it.* balatus, *cfr.* **فَنَّا**.

فَهْمَتْا perficatio.
فَهْدَمْا hydropicus. **فَهْمَذْ** vas.
فَهْمَهْ bubo aris; it. imper. v.
بَهْمَهْ et v. seq.

۵۹. fut. **وَفِي** *ut usit. seq.*

Ethpa. هَفَّاً لِّي oscillavit pandiculatus est; *it.* singultivit.

فَهْمَهْ et اَلْفَهْ singultus, ar.
فُوَاقْ (gall. hoquet).

فَمُهْكَمٌ et فَمُهْكَمٌ it. افْمَهْكَمٌ
oscitatio ; it. singultus.

فُؤَادٌ *phoca.*

فُهْمَةٌ **فُهْمَةٌ**, pugiles.
فُهْمَةٌ **فُهْمَةٌ**, cursores.

مُهْمَّةٌ *nuxxatī*, ars pugilum.

فَةْمَهْ et اـقْدَمْ , pl. *اقْدَمْ* , *πεύκη* , *pinus*.

تinctura. *inus.*; cfr. ar. فَار aestua-
vit, bullivit.

Ethpe. اَنْافَنْ, اَنْافَنْ. *nnq.*
انفانفان *succensuit, iratus est.*

فَنْا	excandescens.	فَهْلَكْتَ v. s. ۷۱۹ .
۱۱۰۵۳ et قَهْلَقْتَ id.		فُكْمَعْ , fut. , imper.
۱۱۰۵۴ قَهْلَقْتَ aestuatio, ira.		فَمْعَ , inf. , in poesi مَفْعُ ,
۱۱۰۵۵ قَهْلَقْتَ excandescens, furor.		quievit, mansit, commoratus
۱۱۰۵۶ قَهْلَقْتَ ira succensus.		est, perstitit ; remansit, su-
۱۱۰۵۷ قَهْلَقْتَ furor.		perfuit ; procul stetit ; cessa-
۱۱۰۵۸ قَهْلَقْتَ , et saepius قَهْلَقْتَ , قَهْلَقْتَ , قَهْلَقْتَ et قَهْلَقْتَ , pl. قَهْلَقْتَ , etc.,		nuit, c. مَنْ ; discessit ;
۱۱۰۵۹ قَهْلَقْتَ turris, arx; cfr. لَحْدَهْ .		هَنْ quiescat ; desistat a
۱۱۰۶۰ قَهْلَقْتَ et rectius لَمْتَهْ قَهْلَقْتَ πορεία , iter.		رَهْ angustias toleravit. لَمْ vel قَهْلَقْتَا vel حَمْدَأَهْ supersedit ab eundo.
۱۱۰۶۱ قَهْلَقْتَ πύρεθρον , pyrethrum herba.		فَمْعَ حَمْكَمْ maneas in pace :
۱۱۰۶۲ قَهْلَقْتَ f. , πυρός , triticum ; it.		لَأَقْمَعْ كَهْلَقْتَ وَقَهْلَقْتَ valeas.
۱۱۰۶۳ قَهْلَقْتَ πυρός , pl. قَهْلَقْتَ pori, corporis meatus.		لَأَقْمَعْ كَهْلَقْتَ non desistas ab opere.
۱۱۰۶۴ قَهْلَقْتَ et لَهْلَقْتَ vox lat. , porta.		لَأَقْمَعْ كَهْلَقْتَ لَهْلَقْتَ nullus super-
۱۱۰۶۵ قَهْلَقْتَ قَوْرَبْتَون , onus.		لَأَقْمَعْ كَهْلَقْتَ لَهْلَقْتَ remansit nisi... لَأَقْمَعْ كَهْلَقْتَ ab excusatione
۱۱۰۶۶ قَهْلَقْتَ , heb. כָּרְדָּה , sors; festum Purim.		defecit. Part. præs. فَلَامْ , nnq. فَلَامْ . Part. præter. قَهْلَقْتَ , inus. , pro quo usitat. قَهْلَقْتَ q. v.
۱۱۰۶۷ قَهْلَقْتَ قَهْلَقْتَ , leetica.		Aph. أَقْمَعْ retrocessit, defecit ;
۱۱۰۶۸ قَهْلَقْتَ pyramides.		supersedit a, excidit a spe,
۱۱۰۶۹ قَهْلَقْتَ et قَهْلَقْتَ , v. s. قَهْلَقْتَ .		frustratus est, aberravit a
۱۱۰۷۰ قَهْلَقْتَ قَهْلَقْتَ πάρη , meretrix.		scopo, c. قَهْلَقْتَ rei.
۱۱۰۷۱ قَهْلَقْتَ قَهْلَقْتَ παρηνοβοσκός , leno.		فَهْلَقْتَ et deriv. , v. s. قَهْلَقْتَ .
۱۱۰۷۲ قَهْلَقْتَ قَهْلَقْتَ πυρσός , signum igneum, tempore belli datum.		فَهْلَقْتَ quies, mansio ; mora, ces-
۱۱۰۷۳ قَهْلَقْتَ قَهْلَقْتَ stacte, cfr. آَقْهَلْقَمْ .		satio ; reliquum vitæ.
۱۱۰۷۴ قَهْلَقْتَ πορφύρα , purpura.		فَهْلَقْتَ id.
۱۱۰۷۵ قَهْلَقْتَ πορφύρον , murex,		فَسْلَمْ , قَسْلَمْ manens, residuus.
purpura.		لَهْلَقْتَ , قَهْلَقْتَ , قَهْلَقْتَ , قَهْلَقْتَ , v. s. حَلْقَهْ .
۱۱۰۷۶ قَهْلَقْتَ , v. s. قَهْلَقْتَ .		فَهْلَقْتَ

فَمَا, ar. فُرْةٌ, rubia tinctorum
herba (gall. garance).
فَمَانِا, فَمَانِا πύθων, hariolus,
vates.

فَمَا, pl. فَمَاتا, f. فَمَادا gulo-
sus.

فَمَاتا voracitas, ingluvies.

فَمَنْ, numerus impar; cfr.
أَفْرَنْ .

لَفَ, heb. לְפָזָר, ar. فَزَرْ , fut.
saltavit; trop. abhorruit, vi-
tavit, c. فَزْ . Part. præs.
فَارْ, فَارْ .

Ethpe. لَفَدָרָא id.; properavit.

Aph. فَرْ saltare fecit.

فَمَانِا saltator; agilis.

فَمَادِهِنْ saltus; celeritas, præ-
cipitatio; levitas in agendo.

فَمَبِنْ et فَمَبِنْ , pl. فَمَبِنْ heb.
פַּחַד, femur, ar. فَخَذْ ; per
extens., nervus lumborum;
it. venæ cervicis.

لَفَ, inus. cfr. heb.
لَفَزْ lascivus fuit, et ar. فَخَنْ in-
temperans fuit.

Pa. فَسْ lascive egit.

Ethpa. لَفَقَسْ id.

Aph. لَفَقْ ad lasciviam indu-
xit. Part. مَفَسِّراً , f. مَفَسِّراً ;
libidinosus.

فَسَّا lascivia, impudicitia.

فَسَّا, f. فَسَّا, impudi-
cens, libidinosus.

فَسَّامَه impudice.

فَسَّادِهِنْ, pl. فَسَّادِهِنْ libido, las-
civia, impudicitia.

فَسَّ, fut. فَسَّ, mollis, debi-
lis fuit; cfr. ar. فَخْ id.

Ethpa. لَفَقَسْ debilitatus est,
extenuatus est.

فَسَّهِسَّ et فَسَّهِسَّ mollis.

فَسَّهِسَّ mollis, debilis mente;
trop. vana res; in pl. لَفَقَسْ
infima plebs.

فَسَّهِسَّهِسَّ mollities, dissolutio;
debilitas, languor.

فَسَّ, heb. פֵצָה, ar. فَخْ , laqueus.

Pa. فَسَّ et فَسَّ v. denom.,
laqueo captavit.

Ethpa. لَفَقَسْ pass.

فَسَّا, ar. فَخَلْ admissarius
(gall. étalon).

فَسَّادَهِنْ, pl. فَسَّادَهِنْ , it. testiculus,
pl. فَسَّادَهِنْ testiculus.

فَسَّادَهِنْ, ar. فَخَوَّةٌ , sexus virilis.

فَسَّهِ, fut. فَسَّهِ usitat.

in part. præs. adæquatus
fuit, par, similis fuit. Part.
præs. فَسَّهِ , f. فَسَّهِ par, adæ-
quatus; congruus. بَهْ وَ فَسَّهِ
quod æquum est, quod deceat.

Pa. فَسْخٌ adæquavit, assimilavit, comparavit; aptavit, perpendit, comparatione assœctus est, cfr. ar. فَهُوَ in-tellexit; c. حَمَلَ vel كَمَلَ contulit librum c. alio; ap. gramm., punctis instruxit.

Ethpa. اَفْسَخَ pass.

فَسْخٌ, pl. فَسْخَاتٌ comparatio, æqualitas; similitudo, respectus; id quod simile est, quod respondet *protoypo*, exemplar; rescriptum, responsio, narratio; adj. æqualis, pl. فَسْخٌ حَدَّتْ فَسْخٌ, pl. فَسْخٌ حَدَّتْ coæqualis; coævus. إِنْ فَسْخٌ إِنْ incomparabilis. حَدَّتْ فَسْخٌ relate ad, ad instar, præ. حَدَّتْ فَسْخٌ per comparationem ad.

فَسْخٌ, pl. فَسْخَاتٌ comparatio, similitudo; relatio, proportio; collatio *libri*. إِنْ فَسْخٌ incomparabiliter. حَدَّتْ فَسْخٌ كَذَّابٌ وَحَقْدَمَعْدُوا كَذَّابٌ quid armorum habet inimicus noster quibus arma nostra opponere non licet? ap. gramm., in pl. interpunctio, puncta diaeritica; إِنْ فَسْخٌ فَسْخٌ comparatio superioritatis.

فَسْخٌ ap. gramm., ad inter-punctionem pertinens.

فَسْخَاتٌ comparative. فَسْخَاتٌ et فَسْخَاتٌ comparativus. فَسْخَاتٌ, pl. فَسْخَاتٌ, heb. כְּבָשׂ, ar. قَبْرَص, carbo. مَفْسَخَاتٌ collatio. مَفْسَخَاتٌ, f. مَفْسَخَاتٌ conferens, comparans; analogicus. مَفْسَخَاتٌ comparabilis; comparativa *particula*. مَفْسَخَاتٌ comparabiliter. فَسْخٌ, v. s.

فَهْمٌ convivium, compotatio, symbolæ (*gall. pique-nique*). حَدَّتْ فَهْمٌ et حَدَّتْ فَهْمٌ id.; cfr. assyr. puhru, et ar. festum in quo Judæi convivia instituunt.

فَهْمَانِيَّا ad convivia pertinens. حَدَّانِيَّا وَفَهْمَانِيَّا, ar. فَخَارٌ, figulus. مَهْمَانِيَّا vas fictile; *absol.* sine مَهْمَانِيَّا id.

Pa. فَهْمٌ v. *denom.*, figulus fuit; per extens., contrivit.

Ethpa. اَفْكَرَتْ contritus est; fictus est.

فَسْخٌ et فَسْخَاتٌ ars figuli. فَهْمَانِيَّا comminutio.

فَهْمَانِيَّا figulus; it. *figulinus*, ar. فَخَارِيَّا.

فَسْخَاتٌ pulverulentus; friabilis.

فَسْخٌ, ar. فَخَتَّ, fut. نُفْسَخَ

effudit, perforavit, foveam fecit.

Pa. فَسَدْ perfodit, discidit.

Ethpa. فَسَدْاً pass.

فَسَدْا m., pl. فَسَدْا, heb. פָּסָדָה, fovea, vorago, abyssus.

فَسَدْا dimin., parva fovea.

فَسَدْا scindens, perforans ; scissor, pl. فَسَدْا.

فَسَدْا pl. فَسَدْا meteorum igneum.

فَسَدْا effossus, perforatus.

فَسَدْا perforatio, scissio.

فَسَدْا et فَسَدْا, heb. et chald. فَسَدْا, vox pers., cibus delicatus.

فَسَدْا coquus.

فَسَدْا, al. فَسَدْا podagra morbus ; cfr. فَسَدْا.

فَسَدْا فَسَدْا πατέλεξ, ormus arbor.

فَسَدْا فَسَدْا πατέρυγιον, pterygium h. e. pellicula in oculo.

فَسَدْا et فَسَدْا πατέρωτός, alatus.

فَسَدْا πατέρνα, calx.

فَسَدْا πατέρις, filix mas planta.

فَسَدْا فَسَدْا πατέρικός, ap. gramm., casualis.

فَسَدْا فَسَدْا gramm., ad casus pertinens.

فَسَدْا πατέρυκτα, cadavera.

فَسَدْا πατάχιός, fluvius.

فَسَدْا πατάσις, gramm., casus ; ap. poet., versus clausula ; ap. log., prædicamenta.

فَسَدْا, pl. فَسَدْا, ar. بَطِيلَة, heb. בְּבֵית הַרְבָּה pepo fructus.

فَسَدْا et فَهُمْ vox pers., præfектus, satrapa.

فَسَدْا præfectura.

فَسَدْا marcidus, putridus.

فَسَدْا πατωγεῖον, hospitium pauperum.

فَسَدْا rubus.

فَسَدْا et فَسَدْا edulia ; sagittiones.

فَسَدْا πάτελον, folium ; lamina ; it. πατέλεξ, ulmus.

فَسَدْا πατίλωσις, ciliorum casus.

فَسَدْا pix.

فَسَدْا inusit. — *Pa.* فَسَدْ saginavit.

Ethpa. فَسَدْا pass., pinguis factus est ; trop. se oblectavit, c. vel s. فَهُمْ.

فَسَدْا saginatio.

فَسَدْا saginatio ; adj. c. præf. ?, pinguis ; it. absol. animal saginatum.

فَسَدْا saginatio ; trop. divitiæ, opulentia.

سَجِنَةً et اسْجِنَةً saginatio.

مَنْسُونٌ qui saginari potest.

سَجِنَةً saginatio, pinguedo.

فَهُوَ, ar. قَطْنَانٌ, fut. نَعْلَمٌ

sensit, intellexit; prudens fuit.

فَهُوَ intelligentia, sagacitas.

فَهُوَ sapiens, sagax; astutus.

فَهُوَ sagacitas, sapientia.

فَهُوَ sapiens.

فَهُوَ et فَهُوَ folium, scriptio; it. πατησις, casus, ap. grammat.; cfr. فَهُوَ .

فَهُوَ stultus, ineptus; perversus.

Ethpa. فَهُوَ v. den., stultus factus est.

فَهُوَ stulte.

فَهُوَ stultitia, ineptia; vaniloquium.

فَهُوَ edulia; cfr. فَهُوَ .

فَهُوَ , pl. فَهُوَ pers., بشري, ar. طَقَّا, discus, patella.; tamentum auri vel argenti.

فَهُوَ πιττάκιον, ar. بَطَاقَة, tabella, chirographum; cfr. فَهُوَ .

فَهُوَ, fut. فَهُوَ discessit, cfr. heb. נִסְעָה id., et ar. قَطْرَنٌ disrupt; it. finem habuit res, cessa-

vit, defecit, excidit; it. fermentatus fuit panis, ar. قَطْرَنٌ .

فَهُوَ مَمْسَى فَهُوَ مَمْسَى vel et absol. فَهُوَ defunctus est, obiit. فَهُوَ حَمْدَهُ abi in domum tuam.

Ethpa. فَهُوَ dilapsus est, evanuit.

Aph. فَهُوَ discedere fecit, dimisit, prætermisit; cessare, desinere fecit, ad finem perduxit, absolvit; abolevit rem, expulit. فَهُوَ vel فَهُوَ , nnq. absol. فَهُوَ explosit labia sua: irriguit.

فَهُوَ discessus.

فَهُوَ fatuus.

فَهُوَ discedens, moriens.

فَهُوَ transiens, caducus.

فَهُوَ discessus, transitus, obitus; cessatio.

فَهُوَ id.

فَهُوَ , pl. فَهُوَ , et فَهُوَ , pl. فَهُوَ , ar. fungus (gall. champignon).

فَهُوَ , فَهُوَ crudus, recens; fermentatus, azymus; in pl. فَهُوَ festum Azymorum, Pascha; trop., cruditas, novitas; puritas. فَهُوَ , Pascha; it. Feria quinta Hebdomadæ Sanctæ.

فَهُوَ , dies dominica Passionis.

- فَهْمَةٌ** fasciæ crurales ; lora.
فَهْمَهْ, **نُوْفَهْ** et **مُهْمَهْ** **فَهْمَهْ**, *pl.*
مُهْمَهْ, *neolog. gr.*, **πάτρονος**,
a voc lat., patronus, mediator, advocatus.
فَهْمَهْ patronatus, patrocinium.
فَهْمَهْ patronatus; fautores.
فَهْمَهْ **پَاخْرِيَّ**, patria.
فَهْمَهْ **فَلَامَهْ**, **فَلَامَهْ** *et* **فَهْمَهْ** **فَلَامَهْ**, *f.*
فَهْمَهْ, *pl.* **فَهْمَهْ** **مَهْمَهْ** *voc lat.*, patricius;
titulus dignitatis apud græcos; *cfr. ar.* بطریق; *it.* præfectus.
فَهْمَهْ, **فَلَامَهْ**, **فَلَامَهْ**, *pl.* **فَهْمَهْ** **مَهْمَهْ** *voc lat.*, patriarcha.
فَهْمَهْ patriarchatus; forma
abbrev. **فَهْمَهْ**.
فَهْمَهْ *v. denom.*, patriarcham
elegit, constituit.
Ethpal. **فَهْمَهْ** *pass.*
فَهْمَهْ, *ar.* بطریق, patriarchalis.
فَهْمَهْ ad patriarcham pertinens, patriarchalis.
فَهْمَهْ patriarchicus.
فَهْمَهْ **پَاخْرِيَّ**, sternutatio.
فَهْمَهْ **پَاخْرِيَّ**, ptarmica
herba.
Ethpal. **فَهْمَهْ** *v. den.*, me-
tropolita creatus est; *cfr.*
فَهْمَهْ *et* **فَهْمَهْ** **فَهْمَهْ**.
فَهْمَهْ, **فَهْمَهْ**; *it.* **فَهْمَهْ** *et* **فَهْمَهْ**,
ar. simus, silo (*gall. camus*); **فَهْمَهْ** **سَهْمَهْ** *id.*
فَهْمَهْ simi conditio.
فَهْمَهْ tunica persica, tiara;
ocreæ genus.
فَهْمَهْ septum (*gall. balustrade*).
فَهْمَهْ *voc lat.*, fibula.
فَهْمَهْ, *pers.* بیت, *ar.* قیچ, cursor, satelles, *spec. e peditibus*.
فَهْمَهْ *id.*
فَهْمَهْ *voc lat.*, paganus, plebeius; *trop.* fatuus.
فَهْمَهْ, **فَهْمَهْ**, *etc.*
πίγανον, ruta agrestis.
فَهْمَهْ **پَاخْرِيَّ**, fons.
فَهْمَهْ *id.*; *it.* **پَاخِيَّ**, laqueus.
فَهْمَهْ massa; *cfr.* قۇرۇخ.
فَهْمَهْ **پَاخْرِيَّ**, pars templi
ubi victimæ cremabantur.
فَهْمَهْ **ئَنْدِلۇغ**, cuneus ligneus,
palus.
فَهْمَهْ, *pers.* بیزىر, mercator circumforaneus.
فَهْمَهْ **پِيْنَس**, pinus *arbor*.
فَهْمَهْ, *ar.* بیتار, *gr.* οἰνοχεῖος,
veterinarius.
فَهْمَهْ *lat.*, vicarius, delegatus.

فَلْلَا, pers., ar. فيل, pl. فَلَّا, elephas, قَنْتَرَةٌ, f. قَنْلَا, قَنْلَةٌ, emph. قَنْلَهُ, pl. قَنْلَهُ, elephas. مَنْلَا, وَقَنْلَهُ, dens elephantis, et مَنْلَهُ, os elephantis: ebur; it. al. sensu part. pass. v. ۷۰.

فَلَّهُ elephantinus.

فَلْلَا v. s. ۷۰.

فَنْكَتَهُ, pl. فَنْكَتَهُ, et فَنْكَتَهُ, قَنْكَتَهُ, قَنْكَتَهُ, قَنْكَتَهُ, f., φιάλη, phiala; discus, patena eucharistica.

فَلَّهُ, v. s. ۷۰.

فَلَّهُ m., dim., phiala, patera.

فَلَّهُ ima pars calicis.

فَلَّهُ f., phiala.

فَلَّامَهُتَمَا φυλακτήρια, phylacteria.

فَلَّهُ φιλολογός, philologus.

فَلَّهُ v. n. فَلَّهُ et فَلَّهُ, f.

فَلَّهُ et فَلَّهُ φιλόσοφος, philosophus, sapientiae studiosus, f. فَلَّهُ, pl. فَلَّهُ, فَلَّهُ, فَلَّهُ.

فَلَّهُ φιλόσοφος philosophia; per extens., sapientia, virtus, vita ascetica.

فَلَّهُ et فَلَّهُ φιλόσοφία, philosophia.

فَلَّهُ φιλόσοφος philosophicus.

فَلَّهُ φιλόσοφος, ratiocinatio. حَبَّ فَلَّهُ فَلَّهُ tractavit philosophice; asceticam vitam egit.

Palp. فَلَّهُ v. den., philosophice vixit.

Ethpalp. فَلَّهُ philosophus, sapiens factus est; it. philosophum se esse professus est.

فَلَّهُ φιλόσοφος philosophiam profitens, philosophiam prætendens.

فَلَّهُ φιλόπονος, labo-
ris studiosus.

فَلَّهُ φιλύρα, philyra, tilia
arbor.

فَلَّهُ φιλάνθρωπος platanus.

فَلَّهُ ἐπιληψία, epilepsy.

فَلَّهُ orbiculus fusi, ar. فَلَّهُ.

فَلَّهُ πελαργός, ciconia.

فَلَّهُ φιλεργία, pietas filialis.

فَلَّهُ φιλαρχία, amor domi-
nationis.

فَلَّهُ φανόλιγός, φελόνιον, paenula,
vestis talaris sacerdotum, casulæ vel dalmaticæ species.

فَلَّهُ πίνος, tinctus metallorum.

فَلَّهُ φήγη, ossifraga avis
(gall. orfraie).

فَلَّهُ et πίναξ, scutella,
patena eucharistica; tabula.

قُبْرٌ *v. denom.*, depinxit.

قُنْدَرٌ scutellarum confector.

قُنْدَسٌ **قُنْدَسٌ** *pīnax*, tabula, catalogus.

قُنْدَخٌ *et قُنْدَخٌ* prototypus, exemplar ; effigies, idea ; gramm. paradigma, forma primitiva.

قُنْدَخٌ *et قُنْدَخٌ* idealis ; gramm. primitivus, radicalis, typicus. **قُنْدَهٌ** *أَقْنَدَهٌ* verbum paradigmaticum.

قُنْدَهٌ *أَقْنَدَهٌ* realitas ; reapse.

قُنْدَهٌ, **قُنْدَهٌ** *et communius* **قُنْدَهٌ**, **قُنْدَهٌ** *pīnax*, persuasio, certa fides, fiducia ; id quod facit fidem, credibilitas, argumentum, probatio, explicatio ; *it.* deprecatio, intercessio. **قُنْدَهٌ** persuasit. **قُنْدَهٌ** *id.* **قُنْدَهٌ** eamdem fidem habentes, fideles. **قُنْدَهٌ**, **قُنْدَهٌ** litteræ testimoniales *qua fides testificabatur.*

Aph. **قُنْدَهٌ**, *fut.* **قُنْدَهٌ**, *inf.* **قُنْدَهٌ**, *denom a præc.*, persuasit ; rogavit, supplicavit ; petiit, interrogavit ; persuasum fecit, erudit, demonstravit, *c. acc. pers.* *et قُنْدَهٌ* *rei* ; *intrans.* persuasum ha-

buit, sibi compertum fuit.

قُنْدَهٌ *أَقْنَدَهٌ* jam tibi demonstravi. **قُنْدَهٌ** *أَقْنَدَهٌ* ut ipsa sibi persuadeat. *Part. act.* **قُنْدَهٌ**, **قُنْدَهٌ** persuadens, *etc* ; persuasum habens.

Part. pass. **قُنْدَهٌ**, **قُنْدَهٌ**, *pl.*

قُنْدَهٌ, *f.* **قُنْدَهٌ**, persuasus, edoctus ; sciens, doctus. **قُنْدَهٌ** *مَنْجَلَهٌ لِّا مَنْجَلَهٌ* in omnibus peritissimi. **قُنْدَهٌ** *مَنْجَلَهٌ لِّا مَنْجَلَهٌ* nescimus quid ei acciderit.

Ethpe. **قُنْدَهٌ** *أَقْنَدَهٌ* *et commun.* **قُنْدَهٌ** (*mutato L in 4 propter emphaticam seq.*), ad persuasionem perductus est, se persuaderi sivit, consensit, obedivit.

Ettaph. **قُنْدَهٌ** exorablem se præbuit.

قُنْدَهٌ persuasorius.

قُنْدَهٌ, *pl.* **قُنْدَهٌ** supplicatio, intercessio ; invitatorium *Officii.*

قُنْدَهٌ persuasor, intercessor ; suasorius ; nomen accentus interpunctionis.

قُنْدَهٌ supplicant ; suasorie.

قُنْدَهٌ persuasio, invitatio ; supplicatio, intercessio.

قُنْدَهٌ scientia, experientia ; *c. ۱*, ignorantia.

persuasus ; obediens, docilis ; c. ۲, pervicax, inexorabilis.

obedientia ; præc. ۲, inobedientia.

id.

oleum picenum.

pisum.

ventriculus avium.

fides.

nauta.

falsus (*id. q. gr. ψευδής*) ;

pseudo seu falsus episcopus, *pl.* pseudoepiscopi.

id. q. pers.

scientiae naturali studens, physicus.

varius, versicolor, leprosus.

et pix.

pisum parvum.

bibliotheca.

peculium.

amaritudo ; astutia, dolus.

ignis ; *it.*, pers. ۲, senex.

et igni resistens.

pyromantia, seu divinatio ex igne.

piratae, prædones.

platea, ambulacrum.

verbeña planta.

thuribulum ; incensum, *pl.* *قَنْتَمَةٌ* ; *cfr. πύρωμα et πυρεῖον*.

neolog. gr., παραχρημάτιος, ædituus.

vox pers., satellites.

insipidus fuit vel factus est *fructus* ; elanguit. *وَذَادَ* contabuit ; *it.* emarcuit *flos*, imminutus est *color*, mitigatus est *ignis* ; *trop.* remissus, flacidus fuit ; exsolevit, defecit. *Part.* *قَدْرًا*.

Pa. *قَدْرًا* insipidum reddidit ; remisit *vim suam*, mitigavit ; irritam reddidit *rem* ; provano habuit *aliquid*.

Ethpa. *وَذَادَ* remissus factus est ; defecit.

Aph. *وَذَادَ* mitigavit.

insipidus, ineptus, vanus ; languidus.

insipienter.

۱۰۰۰ ف۱ insipiditas, fatuitas ; relaxatio, mitigatio.

۱۰۱۰ ف۱ , ar. ف۱ , fut. نف۱ , dissolvit ; contudit, contrivit.

Ethpe. ف۱ pass.

Pa. ف۱ diffregit, comminuit.

Ethpa. ف۱ pass.

۱۰۲۰ ف۱ et ف۱ contusio.

۱۰۳۰ ف۱ confactus, contusus.

۱۰۴۰ ف۱ comminutio, confractio.

۱۰۵۰ ف۱ , pl. ف۱ ictus manuum, colaphus, cfr. ar. ف۱ ; it. ar. بـ ف۱ complosio manuum ; maxilla, mandibulum, gena ; apri dentes ; trop. latus rei, maris, altaris, etc.

۱۰۶۰ ف۱ contusio.

۱۰۷۰ ف۱ , pl. ف۱ fructus sine putamine, ar. فـ فـ .

۱۰۸۰ ف۱ , inus.; cfr. ar. فـ فـ perstitit in mendacio.

۱۰۹۰ Pa. ف۱ garrulus fuit ; audax, impudens fuit. Part. مـ فـ .

Ethpa. ف۱ id.

۱۱۰۰ ف۱ , f. فـ فـ garrulus, contentiosus, impudens.

۱۱۱۰ فـ فـ loquacitas, contentio ; impudentia, petulantia.

۱۱۲۰ ف۱ , fut. نـ فـ ligavit,

۱۱۳۰ فـ فـ لـ سـ مـ constrinxit. vel فـ حـ لـ سـ مـ junxit manus

۱۱۴۰ فـ دـ حـ in deprecando. ferro ligavit : in vincula con-

۱۱۵۰ فـ جـ يـ يـ jecit. Part. pass. فـ فـ ; trop. obligatus.

Ethpe. فـ فـ pass.

۱۱۶۰ Pa. فـ colligavit, fortiter

۱۱۷۰ فـ فـ constrinxit ; trop. implicuit, irretivit curis.

۱۱۸۰ Ethpa. فـ فـ pass.

۱۱۹۰ فـ فـ implicatio.

۱۲۰۰ فـ فـ , pl. فـ فـ constrictio, implicatio ; occlusio januae ; vinculum, impedimentum ; trop. quæstio implicata, sophisma.

۱۲۱۰ فـ فـ ligator.

۱۲۲۰ فـ فـ , it. فـ فـ et فـ فـ repagulum januae.

۱۲۳۰ فـ فـ foculus.

۱۲۴۰ فـ , ar. فـ , fut. نـ فـ disquisivit, exquisivit, spec. pediculos, purgavit caput ; trop. contudit.

Ethpe. فـ فـ pass.

۱۲۵۰ Pa. فـ diligenter perscrutatus est, penitus scrutatus est.

Aph. فـ فـ ut Pa.

۱۲۶۰ فـ فـ perscrutatio, perquisitio.

فَلَّا perscrutator.

فَلَّا, st. c. **فَلَّا**, pl. **فَلَّا**.

quæstio abstrusa; ænigma, allegoria, parabola; typus, symbolum; cfr. heb. פָּלָא usitat. in Niph. פָּלָא abstrusus, arduus fuit.

Pa. **فَلَّا** vel **فَلَّا** v. denom., allegoriam proposuit, parabolice expressit.

Ethpa. **فَلَّا** pass.

فَلَّا et **فَلَّا** allegorice, parabolice, mystice; ænigmatice.

فَلَّا allegoricus, parabolicus.

فَلَّا allegoria, symbolum.

فَلَّا, emph. **فَلَّا**, it. **فَلَّا** φιάλη, phiala; cfr. **فَلَّا**; it. ut seq.

فَلَّا et **فَلَّا** laurus; cfr. **فَلَّا**.

فَلَّا et **فَلَّا** tinea, teredo.

فَلَّا πέλαγος, mare, altum mare.

فَلَّا et **فَلَّا** φιλεταῖριν, philetæria planata, ocymum (gall. basilic).

فَلَّا πλάτυνος, platanus.

فَلَّا παλαιστρικοί, palestræ ludo dediti.

فَلَّا neolog. gr., φλάσκιον, ampulla.

فَلَّا lat., placenta.

فَلَّا v. s. **فَلَّا**.

فَلَّا, pers. شَبَّه, gossypium.

فَلَّا, pl. **فَلَّا** φλέψ, vena, arteriæ.

فَلَّا, heb. פָּלָא, ar. فَلَج, fut. **فَلَّا** fidit, diffidit, dimidiavit, divisit in plures partes; distribuit; assignavit, decrevit alicui honorem, pænam, c. **فَلَّا** pers.; it. intrans. et speciat. **فَلَّا**, fut.

فَلَّا ad medium venit dies; in medio fuit; divisus est. Part. pass. **فَلَّا**, trop. dubius, hæsitans, c. vel s.

فَلَّا etc.; dissentiens, schismaticus; it. ad medium perveniens dies; **فَلَّا** مَتَّا medium aetatem assequentes. **فَلَّا** مَوْرِزا de veritate divisi: hæretici.

Ethpe. **فَلَّا** pass. et refl.; seq. **فَلَّا** discidium fecit; dubitavit, quo in sensu usitatiōr est forma *Ethpa*.

Pa. **فَلَّا** divisit, spec. in plures partes; distribuit, tribuit, accepit ex parte rem; particeps fuit oneris, c. **فَلَّا**.

Part. pass. **فَلَّا**; **فَلَّا** مَفَلَّا labia divisa h. e. mendacia. **فَلَّا** مَفَلَّا dubius; dissentiens. **فَلَّا** مَفَلَّا vita curis distenta.

Ethpa. فَدْكَلْتَ pass. et refl. ; trop. dubitavit, scandalizatus est ; schisma fecit, c. فَدْكَلْتَ. فَدْكَلْتَ لِلَّهُ مَنْفَدْكَلْتَ de ipsius Dei existentia dubii hærent.

فَدْكَلْتَ divisio ; dubium.

فَدْكَلْتَ m., pl. فَدْكَلْتَ semitypnum (ar. دَفَّ, gall. tambour de basque) ; it. φάλαγξ c., phalanx, turma, exercitus.

فَدْكَلْتَ miles; tympani pulsator.

فَدْكَلْتَ, فَدْكَلْتَ pars, spec. dimidia ; فَدْكَلْتَ وَمَدْكَلْتَ meridies ; فَدْكَلْتَ وَمَدْكَلْتَ media nox ; id. vel c. دَفَّ, adverb. media nocte.

فَدْكَلْتَ medium seu perfectam ætatem assecutus ; it. sectio ; latus hominis ; hemiplegia, paralysis morbus, ar. فَالْيَمْ.

فَدْكَلْتَ, فَدْكَلْتَ, pl. فَدْكَلْتَ, فَدْكَلْتَ ut فَدْكَلْتَ ; in composit. sonat uti lat. semi et gr. ἡμί :

فَدْكَلْتَ آقَنْتَا semiariani.

فَدْكَلْتَ homuncio, pumilus. (τύπονος), mulus. فَدْكَلْتَ سَعْنَى meridies.

فَدْكَلْتَ مَةً dimidia ætas.

فَدْكَلْتَ مَدَدَ et فَدْكَلْتَ مَدَدَ semimortuus. فَدْكَلْتَ مَهْمَهْنَى semidiaconus : subdiaconus ;

فَدْكَلْتَ مَدَدَ semihora.

فَدْكَلْتَ hemicerania ; it. sectio, capitulum libri, tomus. فَدْكَلْتَ particeps, cohæres.

فَدْكَلْتَ, فَدْكَلْتَ, pl. فَدْكَلْتَ et فَدْكَلْتَ divisio ; pars distributa, ordinata, inde ordo, turma, classis, factio ; duplicitas, ambiguitas ; dissensio ; schisma. فَدْكَلْتَ indivisibilis.

فَدْكَلْتَ divisim ; dubitanter ; c. مَدَدَ, certo.

فَدْكَلْتَ, فَدْكَلْتَ divisio, pars, spec. media ; dissidium, schisma ; dubitatio ; duplicitas.

فَدْكَلْتَ dimidium ; it. φάλαγξ, phalanx, exercitus.

فَدْكَلْتَ, فَدْكَلْتَ, pl. فَدْكَلْتَ et فَدْكَلْتَ قَدْكَلْتَ divisio, partitio ; distinctio, sectio, factio, partes ; dubitatio, ambiguitas ; it. cellulae apum ; adv. فَدْكَلْتَ, sine dubio, profecto.

فَدْكَلْتَ divisus ; discors.

فَدْكَلْتَ divisim ; passim.

فَدْكَلْتَ duplicitas. c. seq. فَدْكَلْتَ.

فَدْكَلْتَ dividens, distributor ; scindens ; arbiter.

فَدْكَلْتَ divisibilis.

فَدْكَلْتَ divisibiliter.

فَكْمَهٌ dubitatio; divisibilitas.

فَكْمَهٌ φλέγμα, phlegma, pituita, pl., it. **فَكْمَهٌ**, it. **فَكْمَهٌ** et **فَكْمَهٌ**.

فَكْمَهٌ phlegmaticus.
فَكْمَهٌ id.

فَكْبِا et **فَكْبِا**, pers. **فُلَادٍ**, ar. chalybs, ferrum durissimum.

فَكْدَا φλέψ, φλέβα, vena; cfr. **فَكْهَمَهٌ**.

فَكْدَهَمَهٌ φλεβότομον, phlebotomus, scalpellum.

فَكْهَمَهٌ φλεγμονή, tumor, inflammatio.

فَكْلَهٌ, fut. **فَكْلَهٌ** dispersit; dissipavit, disjecit; distraxit, cfr. ar. **فَكَّ**, discidit. *Ethpalp.* **فَكَلَهٌ** pass.; trop. perturbatus est; vagatus est.

فَكْلَهٌ dispersio; confusio.

فَكْلَهٌ et **فَكْلَهٌ** id.

فَكْلَهٌ dispersus.

فَكْلَهٌ dissipatio.

فَكْلَهٌ et **فَكْلَهٌ** pustula.

فَكْلَهٌ φλέγμη, pleuritis.

فَكْلَهٌ πληθυσμός, forma ad lateres conficiendos.

فَكْلَهٌ et **فَكْلَهٌ** φλοιός, liber, cortex.

فَكْلَهٌ et **فَكْلَهٌ** πιλωτός, vestis e pilo; it. tegumentum, cingulum.

فَكْلَهٌ f., palatum, pl. **فَكَلَهَاتٌ**; v. **فَكَلَهَاتٌ**.

فَكَلَهَاتٌ πλοῦτος, divitiae.

فَكَلَهَاتٌ φλόξ, flamma.

فَكَلَهَاتٌ φλογιστικός, flammeus.

فَكَلَهَاتٌ lat., plumbatae scuticeæ.

فَكَلَهَاتٌ φλόμος, verbascum planta.

فَكَلَهَاتٌ lat., opus plumarium.

فَكَلَهَاتٌ, **فَكَلَهَاتٌ**, **فَكَلَهَاتٌ**, certus, quidam; cfr. **فَكَلَهَاتٌ**.

فَكَلَهَاتٌ φύλλον, laurus indica (gall. bétel); cfr. **فَكَلَهَاتٌ** et **فَكَلَهَاتٌ**.

فَكَلَهَاتٌ φλογίτης, buglossa planta.

فَكَلَهَاتٌ πηλός, lutum.

فَكَلَهَاتٌ, fut. **فَكَلَهَاتٌ** et rarius **فَكَلَهَاتٌ**

فَكَلَهَاتٌ heb. חַלֵּב, ar. حَلَب, fidit, aravit terram, c. acc. vel حَلَب, nnq. absol. aravit; inde absol. vel seq. **فَكَلَهَاتٌ** serviit, ministravit; coluit Deum;

فَكَلَهَاتٌ مُهْرَجٌ sacrificavit; vel **فَكَلَهَاتٌ** sacra mysteria peregit, celebravit; laboravit,

exercuit *artem*, negotiatus est ; egit, operatus est ; profuit *res*, ar. أَفْلَحَ ; فَكَسْ ministerium exercuit. فَكَسْ

cogitationes in mente revolvit. Part. act. فَكَسْ , pl. فَلَشْ , st. c. فَلَشْ , pl. فَلَشْ أَمْتَهَا : فَلَشْ Alchimistæ. فَلَشْ militares homines. فَلَشْ in mari operantes : piscatores ; subst., pl. فَلَشْ servus, minister, officialis, miles : operarius, rusticus. Part. pass. فَكَسْ , فَكَسْ ; adject. laboriosus ; gramm. usitatum verbum.

Ethpe. اَفَكْ pass.

Pa. فَكَسْ subegit massam figurulus.

Ethpa. اَفَكْ pass., ut *Ethpe.* ; it. miles factus est.

Aph. اَفَكْ arare fecit, fructificavit ; servire fecit, servitio militari adscripsit ; militavit.

فَهَنْتَنْ , pl. فَهَنْتَنْ aratio ; cultura, cultus : ministratio, ministerium, servitium ; operatio, confectio ; opus, actum ; praxis, usus.

فَهَنْتَنْ ; فَهَنْتَنْ sacrificatio. فَهَنْتَنْ ; فَهَنْتَنْ sacra liturgia.

فَهَنْتَنْ ; فَهَنْتَنْ idololatria.

vices dierum in ministerio sacro. هَنْتَنْ so- cius operis. سَكَنْتَنْ بِفَهَنْتَنْ agri a te exculti.

فَكَسْ , pl. فَكَسْ cultura, agricultura ; servitus. munus, ministerium, cultus ; militia, exercitus. مَهْلُهْنْ بِفَهَنْتَنْ præfectura militaris, seu munus præfectori militum. ١٠٥ دَفَعْتَنْ بِفَهَنْتَنْ addictus erat servitio Francorum.

فَكَسْ cultor, operator ; manualis labor.

فَهَنْتَنْ militaris, servilis.

فَهَنْتَنْ militaris ; it. operarius, agricola.

فَكَسْ操atio, confectio.

فَكَسْ , ar. قَلْبَهْ , agricola, vintor ; cultor.

فَكَسْ agricultura.

مَهْلُهْنْ colendus.

فَلَهْ , heb. פָלֵה , ar. قَاتَ fut. فَعَلَهْ , effugit : se eripuit, elapsus est, c. هَنْ ; fugit, praeteriit eum res, vitavit eum, c. acc. rei vel pers. ; ejecit, excussit, expulit, cfr. ar. لَأْتَ ; it. peperit mulier. Part. pass. فَكَهْ , v. infra فَكَهْ .

Ethpe. اَفَكْ effugit.

فَكْنُوْهَهْ et فَكْنُوْهَهْ πελαργός,
ciconia, cfr. فَكْنُوْهَهْ .

فَكْنُوْهَهْ φιλαργυρία, amor
pecuniae, avaritia.

فَلْمَ, fut. نَعْدَهْ perrupit;
spec. perfodit murum fur; per extens., exquisivit, thesaurum effossum sibi arri-
put, cuniculos effodit; trop. prospexit, scrutatus est.
Part. act. فَدْمًا, f. فَدْمًا; in fem. subst. partitio. فَلْمَةْ مَوْتَهْ bivium.

Ethpe. فَادْمَلِي pass.; vi aper-
tus est; spoliatus est.

Pa. فَدْمَ perrupit; carne de-
spoliavit tortor.

فَدْمًا perruptio, violatio;

أَلْوَهْ adulterium.

فَهَدْمَةْ, pl. فَهَدْمَةْ, قَهَّمَةْ perfossio muri, apertura, cu-
niculus; spoliatio.

فَهَدْمَهْ perfossio, diruptio, exca-
vatio; fovea.

فَهَدْمَا effosso.

فَدْمًا et فَدْمًا, v. s. لَهْ .

فَدْمَهْ et فَدْمَهْ, pl. فَدْمَهْ et فَدْمَهْ πλέθρον, juger;
vieus.

فَهَدْمَةْ πεμπτή, quinta indictio.

فَهَدْمَهْ lut., famulus.

فَهَدْمَهْ et لَهْ mensis

aegyptiacus respondens mensi
Adar Syrorum.

فَهَدْمَهْ πομπή, pompa.
فَهَدْمَهْ كَهْدَهْ ut فَهَدْمَهْ كَهْدَهْ .
فَتَّا annulus.

فَلْتَ et فَلْتَ, heb. פְנַהּ , fut.
نَعْنَ se vertit, se convertit;
reversus est, restitutus est;
trop., ad fidem, ad meliorem
frugem rediit, c. ﴿; it. de-
clinavit dies, sol; seq. alio
verbo aequivalet adv. rursus.
Part. præs. فَتَّا ; فَتَّا
ad vitam redeunt; emph. et
subst. فَتَّا inclinatio; decli-
natio, deflexus; فَتَّهْ وَمَهْ مَهْ vespera.
فَتَّا وَحَدْمَهْ mundi consummatio.

Ethpe. فَاهْلِي, imper. فَلْلِي, pl.
فَاهْلِهْ, ut Pe. in sensu proprio
et trop.; c. ﴿ et لَهْ, intendit
rem; respexit, spec. c. ﴿;
adverb. ut in Peal. لَهْ لَهْ لَهْ non se avertit
i. e. non fuit sedata ira Dei.

Pa. فَتَّ, 3^a p. pl. f. فَتَّسْ, reddidit; seq. مَهْ مَهْ vel
فَهَّمْ, nnq. absol. respon-
dit; فَتَّ سَعْتَلَهْ rependit,
retribuit. فَتَّ مَهْ مَهْ exau-
divit preces. فَتَّهْ مَهْ مَهْ viam
parate; cfr. Pi. v. פְנַהּ .

Ethpa. اَقْفَتْ pass.; it. se vertit, reversus est. لَدُنْهَا مُهَوْنَةً ad Deum nos vertimus, seu confugimus,

Aph. اَقْفَتْ vertere fecit, declinare fecit; vertit, avertit; trop. convertit ad veritatem, fidem; c. « vel حَفْلَةً , nnq. c. حَكْمًا , redire fecit, reduxit; direxit, restituit, reddidit; it. respondit, ut *Pa.*; c. حُمُّرًا , fugit a. اَقْفَتْ نَعْمًا animam restauravit. « اَقْفَتْ اَقْتَيْبَهُ vertit faciem suam ad; trop. se direxit ad. « اَقْفَتْ سَعْيًّا visum vertit ad: intendit; trop. se paravit ad rem. اَقْفَتْ سَوْا tergum vertit: fugere coepit. *Part. act.* مَهْنَةً , مَهْنَةً ; subst. اَمْبَا مَهْنَةً volutio manus; trop. celeriter.

فِنَاءٌ et فِنَادًا reditus, conversio. فِنَاءٌ , فِنَادًا , pl. فِنَاءٌ , فِنَادًا latus, regio, terrae finis, mundi plaga; angulus; c. « , كَفِنَادًا ad partem, ad; c. حُمُّرًا , a parte, jussu alicujus; adverb. حَفْلَةً فِنَاءٌ ubique; حَادَهْنَادًا فِنَاءٌ undique. مُمْكِنَةً فِنَاءٌ in quator mundi partibus.

فِنَاءٌ vespertinus.

فِنَاءٌ , فِنَاءٌ conversio, rever-

sio, reditus; حَيْدَانًا وَفِنَاءٌ annus reversionis: jubilaei annus; it. redditio, restitutio debiti; revocatio mandati; trop. conversio ad fidem; responsio, apologia. قُهْبَهْ مُكَلَّهًا et فِنَاءٌ قُهْبَهْ مُكَلَّهًا responsum, apologia. فِنَاءٌ حَمَلَتْهَا exauditio precum.

فِنَاءٌ redux.

فِنَاءٌ convertens.

فِنَاءٌ مَهْنَةً redire faciens, restituens; exauditor.

فِنَاءٌ مَهْنَةً reditus; conversio.

فِنَاءٌ مَهْنَةً conversionis capax; conversus; ad conversionem spectans.

فِنَاءٌ مَهْنَةً adv.; c. لَمْ , sine reditu.

فِنَاءٌ مَهْنَةً conversio, reversio, reditus; c. حُمُّرًا , abrenuntiatio, قَنْدَقْهُهْ مَهْنَهْ παχδοκεῖτον , ar. قَنْدَقْهُهْ et فِنَاءٌ مَهْنَةً παχδόκειτον , taberna; cfr. قَهْوَهْ مَهْنَهْ et فِنَاءٌ مَهْنَةً , ar. قَنْدَقْهُهْ , nux avellana (*gall.* noisette).

فِنَاءٌ مَهْنَةً et فِنَاءٌ مَهْنَةً , pl. فِنَاءٌ مَهْنَةً παχδέντρος , pandectæ, collectio, repertorium; in pl., locus sepulturæ communis pauperibus et peregrinis.

فِنَاءٌ مَهْنَةً πνεύματος , spiritus.

فِنَاءٌ مَهْنَةً πνευματικός , spiritualis.

فَنْدَمْهُ et فَنْدَمْهُ πυεύμων , pulmo ; cf. فَلَمْهُ .

فَنْمَا , v. قَنْمَا .

فَنْمَهُ اَحْمَدُ πεντάγωνον , quinque angulis constans.

فَنْمَهُ اَمْلَهُ παντοκράτορ , omnipotens.

فَنْمَهُ اَنْ πενταδικός , quinarius.

فَنْمَهُ اَرْ rox lat., pontonium, navigii genus ; it. pons.

فَنْمَهُ اَمْنِي πάντας , omnino.

فَنْمَهُ اَرْ et فَنْمَهُ πεντάροβον , paeonia (gall. pivoine).

فَنْمَهُ اَرْ ; it. اَرْ مَهْدَهْ فَنْ et اَرْ مَهْدَهْ فَنْ πενتηκοστή , Pentecoste.

فَنْمَهُ اَرْ , فَنْمَهُ اَرْ etc., pl. فَنْمَهُ اَرْ , فَنْمَهُ اَرْ فَنْمَهُ اَرْ , imaginatio ; id quod percellit imaginationem, pompa ; phantasia, doctrina hæreticorum de corpore fantastico Christi ; spectrum, præstigiæ, hallucinatio.

Palp. فَنْمَهُ اَرْ v. denom., imaginationi ostendit, phantasiam excitavit.

Ethpalp. فَنْمَهُ اَرْ imaginatus est.

فَنْمَهُ اَسْ imaginarius.

فَنْمَهُ اَسْ , pl. اَسْ فَنْمَهُ اَسْ

phantasiasta, hæreticorum nomen.

فَنْمَهُ اَسْ , pl. اَسْ فَنْمَهُ اَسْ .

φάντασμα, phantasma.

فَنْمَهُ اَسْ et فَنْمَهُ اَسْ imaginatione conceptus, imaginarius.

فَنْمَهُ اَسْ اَسْ παντησίς , Præsentatio Christi in Templo.

فَنْمَا , v. قَنْمَا .

فَنْمَهُ اَسْ spureus, nothus.

فَنْمَهُ اَسْ , f. ; pl. فَنْمَهُ اَسْ φωνή , clamor.

فَنْمَهُ اَسْ , et فَنْمَهُ اَسْ , it. قَنْمَا , et فَنْمَهُ اَسْ φωνός , ar. φωνός , lampas, lucerna.

فَنْمَهُ اَسْ et فَنْمَهُ اَسْ , f. πανσέληνος , plenilunium.

فَنْمَهُ اَسْ pix sicca.

فَنْمَهُ اَسْ — Pa. قَنْمَا , heb. פַנְמָה , ar. قَنْمَهُ , oblectavit. Part. pass. مَهْنَمْهُ , f. emph. مَهْنَمْهُ delicate, voluptatibus indulgens ; gratus.

Ethpa. فَنْمَهُ اَرْ laute vixit ; fruitus est, c. اَسْ rei. ; emolitus est.

Aph. فَنْمَهُ اَرْ lætificavit ; emollivit.

فَنْمَهُ اَسْ deliciae, oblectamenta, luxus.

فَنْمَهُ اَسْ vita delicata, luxuriosa.

فَنْمَهُ اَسْ delicate vivens.

فَنْمَهُ اَسْ voluptas, vita somptuosa.

manus, cfr. فَهْمَةً ; it. linteum, abstensorium ; it. in emph., pagina libri. مَبْرُوْفٌ فَهْمَةً vestigium plantæ pedum ; it. lentigines in cute.

فَهْمَةٌ v. s. فَهْمٌ .

فَهْمَةً permittens, concedens. مَفْعُولًا فَهْمَةً permissio, potestas ; sententia judicis.

فَهْمَةٌ, فَاهْمَةٌ فَاهْمَةٌ (فَاهْمَة), sententia, decisio ; it. فَاهْمَةٌ (فَاهِمْكَس), species ; ortus siderum.

فَهْمَةٌ lapillus ; cfr. لَبَّى , ar. فَسَيْقَةً (gall. mosaïque) ; it. talus, tessera ad ludendum.

فَهْمَةً, pers. - ar. اِسْفَنْتَ , medica (gall. luzerne).

فَهْمَةٌ, heb. פְּשָׁתָה et פְּשָׁתָה , fut. فَهْمَةً incessit, prosiliit, transiliit, c. נִקְרֵא rei ; trop. aggressus est ; tetendit ad rem, expetivit, mortem oppetiit, c. נִקְרֵא ; transgressus est mandatum, c. נִקְרֵא rei , cfr. ar. فَشَّمَ distentus est, se extendit.

Ethpe. فَهْمَةً incessit.

Pa. فَهْمَةً discussit.

Ethpa. فَهْمَةً gressus est.

فَهْمَةً, emph. فَهْمَةً, it. فَهْمَةً , pl. فَهْمَاتٍ, فَهْمَاتٍ gressus, passus et mensura ; apertura

in lacinia indusii ; rima oris piscium ; it. coitus.

فَهْمَةً acerra ignis.
فَهْمَةً prestigiae.

فَهْمَةٌ, heb. פְּשָׁתָה , fut.

فَهْمَةً secuit, abscidit, excidit ; castravit ; trop. decidit rem, definivit, terminavit ; statuit ; decrevit, præscripsit ; pactus est, c. נִקְרֵא , nnq. c. acc. rei ; sibi statuit, c. נִקְרֵא agentis et accus. rei ; impers. נִקְרֵא فَهْمَةً statutum est ; abrupit sermonem, abbreviavit, suppressit, prohibuit ; excommunicavit ; intrans. c. נִקְרֵא , destitit a, abstinuit, renuit ; cessavit, absoluta est res. فَهْمَةً أَوْ نِكَارًا فَهْمَةً iter intercepit prædo, (id. q. ar. قَطْعَ الْطَّرِيقَ), nnq. c. נִקְרֵא , viam stravit ; فَهْمَةً فَهْمَةً vias desertas reliquerunt. فَهْمَةً مَدْحَأْ فَهْمَةً sermonem seu commercium cum aliquo cessavit.

فَهْمَةً فَهْمَةً spem alterius vel suam frustravit. فَهْمَةً فَهْمَةً definitive pronuntiavit. Part. act. فَهْمَةً, فَهْمَةً ; gramm. nomen puncti. Part. pass. فَهْمَةً, فَهْمَةً ; c. נִקְרֵא agentis, apud se statutum habuit ;

فَهْم **حَتْتَنْ** persuasus.

فَهْمَنْ **سِبْرَنْ** *spe abscissus sum*: despero.

Ethpe. **فَهْمَلْ** *pass.*; **فَهْمَنْ** **حَدْنَ** in domo sua inclusus est.

Pa. **فَهْمَ** abscidit, amputavit, minutatim secuit; *trop.* decretivit; *it.* angorem animi sustulit. **Part. pass.** **فَهْمَنْ**, **فَهْمَمْ**; *adject.* minutus.

Ethpa. **فَهْمَلْ** *pass.*

فَهْمَ, **فَهْمَمْ**, sectio, divisio, abscissio; castratio; interrupcio, intervallum; pars, portio, segmentum; *trop.* excommunicatio, anathema; *it.* decisio, decretum, sententia; gramm. *apud.* Syr. Orient. apocope (*ut* لَمْبَنْ); *adverb.* **فَهْمَ** **حَصْنَ** in summa. **فَهْمَ** **حَصْنَ** circumcisio. **فَهْمَ** **وَنْ** decollatio. **فَهْمَ** **حَدْنَ** desperatio.

فَهْمَمْ abscissio, divisio; pars, segmentum; *trop.* decisio, decretum, fatum. **فَهْمَنْ** **وَنْ** **أَلْ** partitio tributi, capitatio.

فَهْمَمْ secans; sectio; aphorismus; gramm., nomen puncti.

فَهْمَمْ absolute; summatim.

فَهْمَمْ **أَلْ** sectio, dissectio.

فَهْمَمْ, **فَهْمَنْ** præcisis, *inde* brevis, *pl. f.* **فَهْمَمْ** **أَلْ** spec.

subst. usurp. abbreviatio, compendium, breve a Pontificibus datum; trop. finalis decisio, inde سَنَا وَفَهْمَةً ultimum seu novissimum tempus, judicium extremum in fine mundi. أَهْنَا وَفَهْمَةً, حَنْأَا وَفَهْمَةً et حَدْنَا id. مَهْنَا وَبِهِ وَفَهْمَةً epitome seu breviarium; adverb. أَلْ فَهْمَمْ breviter.

فَهْمَمْ breviter.

فَهْمَمْ, **فَهْمَمْ** separatio; **فَهْمَمْ** compendiose.

فَهْمَمْ compendiosus. **فَهْمَمْ** **فَهْمَمْ** epitome.

فَهْمَ pannus.

فَهْمَمْ, *pl.* **فَهْمَمْ** sectio, abscissio, pars; decisio; *trop.* schisma; *it. vel* **فَهْمَمْ** lat., posca, oxymel.

فَهْمَمْ secans, incisivus; divisibilis.

فَهْمَمْ divisibilis; *c. ن*, indivisibilis; atomus.

فَهْمَمْ divisibiliter; *c. ن*, indivisibiliter.

فَهْمَمْ sectio; divisibilitas. **فَهْمَ** lat., fiscus.

فَهْمَمْ *et* **فَهْمَمْ**, *pl.* **فَهْمَمْ** *et* **فَهْمَمْ** vox lat., ar. قَسْيَةٌ, piscina, aquæductus.

فَهْمَمْ, chald. צַבְיָא, *pl.*

فَهْمَتْهَا *fascia*, *vitta*; *sindon*.
Palel **فَهْمَفْ** *v.* *denom.* *a* **فَهْمَهْمَهْفَا** *ἐπίσκοπος*, *episcopum* elegit *vel* constituit; (*cfr.* **يَهْلَفْ**).
Ethpalal **فَهْمَهْفَ** *ا* *فَهْمَهْفَا* *pass.*

فَهْنَ sprevit, *id. q.* **حَهْنَ**.
Pa. **فَهْنَ** respuit, abolevit.
فَهْنَا *et c. l* *prosthet.* **أَفَهْنَا**, *capistrum*, restis.
فَهْنَمْ legumina ut pisa et fabae; *cfr.* **فَهْنَمْ**.
فَهْنَمْ, *v. s.* **فَهْنَمْ**.
فَهْنَمْ, *pl.* **فَهْنَمْ**, *pers.*, بَشْرٌ, بَشْرَوَة, *vas* *figulinum*.
فَهْنَمْ *et* **فَهْنَمْ**, *it.* **فَهْنَمْ**, *pers.*, دَسْنَة, **فَهْنَمْ** *et* **فَهْنَمْ**, *ar.* فُسْنَق, pistacium. **فَهْنَمْ** *فَهْنَمْ* color viridis pistacii.
فَهْنَمْ **فَهْنَمْ** *وَهْنَمْ* fructus nucis unguentariæ.
فَهْنَمْ pistacio similis.

فَهْلَمْ *et* **فَهْلَ**, *heb.* פְּלָמֵ, *fut.*
فَهْلَ, balavit *agnus*; *per extens.*, clamavit.
Pa. **فَهْلَ** *id.*
Aph. **فَهْلَ** clamare fecit.
فَهْلَ balatus, clamor.
فَهْلَ qui balat.
فَهْلَ, *heb.* פְּלָמֵ, *ar.* فَهْلَ, *fut.*

فَهْلَ verberavit, contrivit, contudit, diffregit; *it.* pullos exclusit avis. *Part. act.* **فَهْلَ**, *pl. f.* **فَهْلَ**. *Part. pass.* **فَهْلَ**; vulneratus: *adject.* debilis, macer.

Ethpe. **فَهْلَ** *pass.*
Pa. **فَهْلَ** penitus contrivit.
Ethpa. **فَهْلَ** *pass.*
Aph. **فَهْلَ** exclusit vel excludere fecit ova; *trop.* **كَهْلَمْ**، **بَهْلَمْ** *مَهْلَمْ* excludere faciens serpentes; *c.* **كَلَّ**, in jurgia erupit.
فَهْلَمْ *et* **فَهْلَمْ** contritio.
فَهْلَ, **فَهْلَ**, *et ar.* فَعَل, fut.
فَهْلَ operatus est, vix usitat. *præter part.* **فَهْلَلْ**; subst. usurpat., operarius, *ar.* فَاعِل. **فَهْلَلْ** operatio, opus.
فَهْلَلْ operarius.
فَهْلَلْ, *pl.* **فَهْلَلْ** opus, operatio, labor; officium.

فَهْلَ, *heb.* פְּלָמֵ, *ar.* فَهْلَ, *fut.*
فَهْلَهْ distendit, aperuit, spec. os; hiavit. *Part. act.* **فَهْلَ**, **فَهْلَ**. *Part. pass.* **فَهْلَ**; hians.
Ethpa. **فَهْلَ** *pass.*
فَهْلَ hiatus oris, oscitatio.
فَهْلَ hiatus; *it.* fissura, caverna.

فُرْتا	et قَدْهَنْا	Ethpa. أَلْقَرْبَنْا pass.
فُرْتا	et emph. أَلْهَنْا , ar. فَاعِرَةَ ,	فُرْتا liberatio.
	piper aromaticum (cubeba);	مَهْرُوتَنَا liberator.
	it. xanthoxylon planta.	مَهْرُونَهَا liberatio.
فُرْتا	, pl. قَفْتَنْا πάπας , pa-	مَهْرُونَتَا liberatus.
	pa, titulus dignitatis patri-	فُرْتا , v. s.
	archarum et episcoporum ;	فُرْتَهَمْخَا princeps, magistratus.
	Papa, Summus Pontifex Ro-	
	manus.	
فُرْتا	, pers.-ar. بَيْتَعَنْا , psittacus.	فُرْتا قُرْمَبَا , fons, scaturigo ;
فُرْتا	فَأَلْمَسْ et قَفْتَهَسْ , فَأَفْتَسْ	cfr. chald. צָרְדָא , it. ar. تَفَصَّدْ fluxit, a صَدْ sanguinem e ve-
	papa, patriarcha.	nis extraxit.
فُرْتا	id. ; — it. πάππος , avus.	فُرْتَهَلْكَهَا , fut. مَهْلَكَهَا hil-
فُرْتا	فَقْمَسْ παππίνχ , dim., patercu-	ris fuit, gavisus est, splen-
	lus.	duit ; cfr. heb. הַלֵּל et ar.
فُرْتا	فَعْنَمْ paternitas spiritualis.	فَضَّهَ nituit, splenduit. Part.
فُرْتا	فَهْفَهَا eclipsis.	فُرْتَا قُرْمَسَا , adject.
فُرْتا	فَعْنَمْ πέπλος , papaver spu-	usurp., hilaris; nitidus, splen-
	mosum.	dens; serenus; festivus.
فُرْتَا	فَعْنَهَنْا lat., papilio, tento-	Ethpe. أَلْفَرْتَا exhilaratus est ;
	rium (gall. pavillon).	laetus fuit.
فُرْتَا	فَهْفَهَا πέπων , melo.	Ethpa. أَلْفَرْتَا exsultavit ; de-
	فُرْتَا فَهْفَهَا πεπρωγμένَا , opera-	ferbuit mare.
	ta ; acta.	Aph. أَلْفَرْتَا lætificavit ; it. jo-
فُرْتَا	فَهْفَهَا et فَهْفَهَا , فَهْفَهَا etc.	catus est ; splendere fecit ;
	πάπυρος , papyrus,	denom. a فُرْتَا , Pascham
فُرْتَا	فُرْتَا , imper, v. قَوْ .	celebravit.
فُرْتَا	inus. ; cfr. heb. הַלֵּל , et	فُرْتَا lætitia.
	ar. فَصَى distendit, separavit.	فُرْتَا فُرْمَسَاهَهَا laete ; sponte.
Pa.	فُرْتَا liberavit, servavit ;	فُرْتَا فُرْمَسَاهَهَا laetitia, exsultatio;
	tuitus est, c. مَنْ rei. Part.	jocus.
	pass. مَهْرُوبَا , مَهْرُومَا ; innocens.	فُرْتَا , heb. פֶּחָה , ar. فَضَّهَ ,

Pascha, festum Paschæ ; agnus paschalis.

فُرْهَمَّدًا stella in fronte jumenti (ar. غرّة).

مُعْرِسْتًا exhilarator.

مُعْسَنَّا læte.

مُحْرَسَنًا jocus.

فَرْكٌ , heb. פָּרָק , ar. فَصْل , fut. فُرْهَمَّدٌ fidit, serra secavit, disruptit; extendit alas; trop. sibi viam aperuit; librum explicavit.

Ethpe. فَرْعَلٌ pass.

Pa. فَرْقٌ dissecuit.

Ethpa. فَرْقَلٌ pass.

فُرْلًا dissectio.

فُرْلًا , emph. فُرْلًا , pl. فُرْلًا pars, rei; cfr. heb. פְּנַזֵּע et ar. فَصْنَع disruptit; it. columna libri; pannus laceratus; pars sorte obtingens, sors, status; cfr. فُرْلًا id., et بَعْض sortitus est; it. census, retributio poenæ, sententia. فُرْلًا اكْهَمَ فُرْلًا tripartita *Chronica*. أَوْهَنَ فُرْلًا liber in quatuor columnas divisus: Tetrapla. مُهَدَّدَ فُرْلًا وَسْهَنَ mihi obtigit retributio h. c. poena peccatorum meorum.

۱۰۹ , heb. טִבְעָה , fut. تُعْمَمُ , imperavit, jussit, edixit c. أَمْكَنَ pers. vel duplii acc. ; أَمْكَنْ قَعْدَنْ quæ nobis præcepisti; sc̄epe jungitur futuro c. præf. ، vel præterito præced. o. v. g: قَعْدَنْ وَنَمَدَنْ vel قَعْدَنْ وَنَمَدَنْ خَدَنْ domum ipsi dari jussit; it. præfecit, spec. c. لَكَ vel لَرِي aut pers. فَعْلَمَنْ كَعْدَنْ حَرْبَنْ لَكَ أَمْعَنْ te constituit ducem super Israel; it. requisivit, visitavit, c. acc. نَنْق. c. لَكَ ; trop. benigne asperxit Deus; vindicavit injurias Deus, punivit (ar. إِفْتَقَد) ; adscribi jussit; mandavit moriens, legavit; valedixit mundo, defunctus est, c. فَمْ ; desideravit, instanter rogavit; cfr. ar. فَتَّد desideravit rem perditam, orbatus est aliquo; gramm., فَكَدَأْ أَبَدَأْ فَعْلَمَنْ , imperativus verbi. فَعْلَمَنْ وَنَمَنْ judicium instituit, judicavit. فَعْلَمَنْ مُعْكَبْ jussum dedit. Part. pass. فَعْلَمَنْ ، فَعْلَمَنْ وَنَمَنْ أَيَّهْ ; فَعْلَمَنْ illud quod tibi præceptum est. Ethpe. فَعْلَمَنْ وَنَمَنْ pass. ; فَعْلَمَنْ وَنَمَنْ mandatum accepit. Pa. فَعْلَمَنْ jussa dedit; mandavit

moriens; testamento dedit; adscripsit; *it.* imperare fecit, praefecit, *c. & pers.*

Ethpa. فَعَلَهُ اِنْفَاقٌ pass. ; *c.* مُحْرِّر *rei*, abstinere jussus est; *it.* visitatus est a *Deo*, per extens. punitus est.

Aph. فَعَلَهُ roboravit.

فِعْلٌ mandatum, visitatio; oratio, *ar.* قَدْ ; *it.* vinum mellitum, *ar.* قَدْ .

فِعْلٌ mandans, jubens; princeps. فِعْلٌ, فِعْلٌ visitatio; mandatum, jussus; potestas jubbendi, auctoritas; præfectura; mandata suprema *defunctionum*, inde obitus. فِعْلٌ *juxta præceptum Domini.*

فِعْلٌ imperativus.

فِعْلٌ visitatio.

فِعْلٌ, f. اِنْفَاقٌ imperator, dux, dominus; inspector, curator, tutor; *apud. gramm.*, imperativus, (*forma abbrev.* ف) ; *it.* nomen puncti *cum imperativo vel sententia imperativa adhibiti.*

فِعْلٌ imperative.

فِعْلٌ commendatio, adhortatio, jussio; imperium, principatus; *grammat.*, modus imperativus.

فِعْلٌ imperative.

فِعْلٌ visitatio; mandatum; legatum.

فِعْلٌ, pl. فَعَلَاتٌ mandatum, ordinatio; testamentum.

فِعْلٌ præcipiens; testator.

فِعْلٌ, pl. مَفْعُولَاتٌ præcep-tum.

فِعْلٌ مَفْعُولٌ mandata recipiens; subditus.

فِعْلٌ مَفْعُولٌ coacte, vi præcepti.

فِعْلٌ, fut. فَعَمَّ, ar. فَعَمَّ floruit, germinavit. Part.

فِعْلٌ, pl. m. فَعَلَاتٌ, f. فَعَلَةٌ ; *it.* decens, utilis, aptus, et *impers.*, æquum est, decet.

Pa. فِعْلٌ floruit; *it.* profuit.

Ethpa. فَعَلَهُ اِنْفَاقٌ adjumentum vel utilitatem percepit.

Aph. فَعَلَتْ flores protulit, absol. vel seq. فَعَلَتْ .

فِعْلٌ et فَعَلَاتٌ flos, germen.

فِعْلٌ dim., flosculus.

فِعْلٌ convenienter.

فِعْلٌ commodum.

فِعْلٌ decens, aptus.

فِعْلٌ florens, floridus.

فِعْلٌ consilium.

فِعْلٌ utilis, conveniens; *impers.*, satius est, expedit.

فِعْلٌ saltus, saltatio.

فَعْلَةٌ, vox ar. فَقِيَةٌ, jurisconsultus apud Mahumetanos.

فَعْلَمٌ fæx; cfr. بَعْلَمٌ.

فَعْلَمٌ lat., peculium.

فَعْلَلٌ neolog. gr. φέκλη, lat., fæcula, fæx.

فَعْلَلٌ, فَعْلَلٌ et فَعْلَلٌ, neolog. φακιόλιον, pallium, spec. vestis Episcoporum Nestorianorum; mappa, mantile; it. mitra, cidaris (gall. turban).

Ethpaial فَعْلَلٌ cidari caput operuit.

فَعْلَلٌ ποικίλη, variegatum vestimentum.

فَعَلَّ, fut. بَعْلَمٌ disrupt; trop. explicavit parabolam; sœpius intrans. disruptus est, distortus est, crepuit; cfr. heb. בְּקַיָּה, diffregit et ar. فَعَمَ crepuit.

Ethpe. فَعَلَلٌ crepuit.

Pa. فَعَلَلٌ contudit, disrupt, subegit massam; crepus edidit vel edere fecit, crepuit.

Ethpa. فَعَلَلٌ pass.

Aph. فَعَلَلٌ disrupt; it. crepuit, striduit.

فَعَلَلٌ vel فَعَلَلٌ, it. fisura, hiatus; fragor; it. φυκίς, alga.

فَعَلَلٌ heb. פְּקַדֵּת, ornamen-

tum sculptile, capitellum columnæ; it. in pl., flores arborum.

فَعَلَلَةً scissura.

فَعَلَلَةً crepitatio.

فَعَلَلَةً pustula.

فَعَلَلَةً vigil nocturnus.

فَعَلَلَةً funda.

فَعَلَلَةً, pl. heb. תְּשִׁקָּה, fructus colocynthidis; it. grossus seu ficus immatura; it. in pl., vermes casei.

فَعَلَلَةً, st. cst. فَعَلَلَةً, pl. heb. תְּמִזֵּה, ar. بَقْتَة, campus, ager, planities.

فَعَلَلَةً campestris; paganus. أَوْتَدُهُمْ أَوْتَدُهُمْ planities.

فَعَلَلٌ inus. — Pa. فَعَلَلٌ effutavit, vana locutus est, c. تَأْكِيلٌ pers.; cfr. بَقْتَهُ id.

فَعَلَلٌ, pl. فَعَلَلٌ garrulitas, verbositas; pl. nugae.

فَعَلَلٌ garrulus, vaniloquus.

فَعَلَلَةً inepte.

فَعَلَلَةً garrulitas.

فَعَلَلَةً garrulus.

فَعَلَلٌ, vide فَلَامٌ.

فَعَلَلٌ, fut. بَعْلَمٌ rabidus factus est; trop. furit libidine, exarsit ira.

<i>Ethpe.</i> ئەپە فەرۇتى.	<i>Baptismatis</i> ; it. produxit rem, carmina edidit.
<i>Ethpa.</i> ئەپە, <i>id. q. Ethpe.</i>	<i>Ettaph.</i> ئەپە ئەپە editus est liber.
<i>Aph.</i> ئەپە rabiosum fecit; insanire fecit.	فَأَوْمَرَ, heb. pl. فَأَوْمَرُ, fructus, proles; trop. effectus; فَأَوْمَرَ وَبِهِ فَأَوْمَرٌ fructus mirabiles. فَأَوْمَرَ وَمَثْلَهُ فَأَوْمَرٌ fructus terebinthi. فَأَوْمَرٌ porrum.
فَمَنْا, f. فَمَنْا rabidus, furens.	فَأَوْمَرٌ fructifer; utilis.
فَمَنْا rabide.	فَأَوْمَرٌ <i>id.</i>
فَمَنْا rabies, furor; dementia.	فَمَنْا progenies; fecunditas.
فَمَنْا rabidus.	فَمَنْا <i>id.</i> ; germen.
فَمَنْا, فَمَنْا furens, rabidus; it., vox ar. فَقِيرٌ, mendicus (gall. fakir); <i>it. ut seq.</i>	فَمَنْا et فَمَنْا, ar. فَرَزَةٌ, pl. فَمَنْا vestis pellicea; cfr. فَنْا, s. فَنْا.
فَمَنْا torulus, amictus, cidaris; cfr. فَمَنْا.	فَهْوَمَا sors, v. s. فَهْوَمَا.
فَمَنْا id.	فَهْوَمَا, pl. فَهْوَمَاتٌ; it. φορεῖον, lectica; cfr. فَهْوَمَهْ فَهْوَمَهْ sub rad. فَهْوَمَا.
فَمَنْا, pl. فَمَنْا, ar. فَتَارٌ, vertebra.	فَنْا f., emph. فَنْا, pl. furfur; porrigo; <i>it. فَنْا</i> numerus impar.
فَمَنْا et فَنْا, heb. فَرَزَ, fut.	فَنْا فَنْسَدْ furfur.
فَنْا fecundus fuit, crevit; fructus edidit; genuit.	فَنْا فَنْسَدْ furfureus.
<i>Ethpe.</i> فَوْلَى multiplicatus est; <i>it. scissus est, cfr. ar. فَرَى.</i>	فَنْا, al. فَنْا, pl. فَنْا lorum.
<i>Ethpa.</i> فَفَلَى promotus est.	فَنْا et فَنْا, v. s. فَنْا.
Aph. فَفَلَى secundavit, cresce-re fecit; fructus edidit; pro-creavit, genuit; trop. spiri-tualiter generavit <i>Episcopus sacerdotes h. e. ordinavit; vi-tam spiritualem dedit aqua</i>	فَفَلَى locusta.
	مَفْتَنْسَهَا, مَفْتَنْسَهَا, f. fecundans; episcopus ordina-tor vel consecrator, unde in sensu spirit. et antonomastice

apud Jacobitas Maphrianus seu primus post Patriarcham Episcopus; nnq. ipse Patriarcha; it. fecundus, generativus. مَفْتَنَةً مَفْتَنَةً مَفْتَنَةً facultas procreandi. مَفْتَنَةً مَفْتَنَةً genitalia.

Ethpalpal مَفْتَنَةً v. *denom.*, maphrianus electus est.

مَفْتَنَةً generativus; ad maphrianum pertinens.

مَفْتَنَةً fecunditas, procreatio, vis procreandi; Maphriani dignitas.

مَدَّه مَدَّه فَرَّا مَدَّه، claustra, sepes.

مَدَّه et deriv., v. s. فَرَّا .

مَدَّه فَرَّا πέρηντος, dies praecedens octavum diem, seu pridie hujus diei.

مَدَّه φαρμακιόν (φαρμάκιον), collyrium.

مَدَّه πέρηση, terminatio.

مَدَّه et مَدَّه προθεωρία, præfatio.

مَدَّه a παράβολος, parabolarius, bestiarius.

مَدَّه παραβάτης, transgressor; apostata.

فَرَّا, inus.; cfr. ar. فَرَّا dilatavit; trop. tristitiam dissipavit.

Ethpe. مَفْتَنَةً splenduit, ut usitat. seq.

Aph. مَفْتَنَةً renidens fuit, splenduit *flos*, etc.; trop. difusus, gavisus est; it. renidere fecit; trop. laetificavit, oblectavit, ar. أَفْرَجَ . Part.

مَفْتَنَةً ، مَفْتَنَةً splendens; splendescere faciens, oblectorius. مَفْتَنَةً vestes splendidiae.

Pali. مَفْتَنَةً oblectavit. Part. act. مَفْتَنَةً ، مَفْتَنَةً ; pl. f. مَفْتَنَةً oblectamenta. Part. pass. مَفْتَنَةً ، مَفْتَنَةً .

Ethpali. مَفْتَنَةً delectatus est, se oblectavit.

مَفْتَنَةً oblectatio.

مَفْتَنَةً splendor; it. ut مَفْتَنَةً .

مَفْتَنَةً ut usitat. seq.

مَفْتَنَةً oblectatio, laetitia, voluptas.

مَفْتَنَةً splendide.

مَفْتَنَةً splendor.

مَفْتَنَةً oblectorius.

مَفْتَنَةً oblectatus.

مَفْتَنَةً milium, panicum milaceum.

مَفْتَنَةً pro مَفْتَنَةً , paedagogus.

مَفْتَنَةً , ar. فَرَّاج , it. مَفْتَنَةً , f.

مَفْتَنَةً , pl. m. مَفْتَنَةً , f.

مَفْتَنَةً pullus.

فَرْجَهُون, pers.-ar., بُرْجَد, para-gauda seu vestis auro insig-nita.

فَرْجُون. ar., فَرْجُون, strigilis; cfr. *infra* فَرْجٌ.

فَرْجَهُون, فَرْجَهُون et فَرْجَهُون aromatis species.

فَرْجَهُون aquaeductus; cfr. فَرْجَهُون s. فَرْجٌ.

فَرْجٌ a gr. παραγγέλλω, praecepit; seq. مِنْ, vel فَرْجٌ rei, prohibuit; it. denuntiationem misit, c. acc. pers.

Ethpa. فَرْجَهُون pass.

فَرْجَهُون παραγγέλια, praecep-tum; prohibitio, interdictio, interdictum.

فَرْجَهُون administratio.

فَرْجَهُون, pl. فَرْجَهُون neolog. φραγέλλιον, lat., flagellum.

فَرْجَهُون et فَرْجَهُون, pl. فَرْجَهُون tractatus; negotium, opus.

فَرْجَهُون παραγματευτής, mercator.

فَرْجَهُون, παραγματικόν, pl. فَرْجَهُون edictum impe-ratoris.

فَرْجَهُون, فَرْجَهُون nota, فَرْجَهُون παραγραφή, paragraphus, nota.

فَرْجٌ, fut. فَرْجٌ, heb. זְרַגָּה,

ar. فَرَد, discessit, se separavit; avolavit, fugit; it. separavit.

Ethpe. فَرْجَهُون in partes divisus est.

Pa. فَرْجٌ discedere fecit, fuga-vit, ar. فَرَد.

Ethpa. فَرْجَهُون fugatus est; comminutus est.

Palel. فَرْجَهُون separavit, spec. comminuit, contrivit.

Ethpal. فَرْجَهُون pass.

Aph. فَرْجٌ avolare fecit; trop. cor seduxit.

فَرْجَهُون fuga somni ab oculis, in-somnia; it. ut فَرْجَهُون.

فَرْجَهُون f., emph. فَرْجَهُون et فَرْجَهُون pl. فَرْجَهُون heb. فَرْجَهُون granum, bacca, acinus; atomus. فَرْجَهُون margarita; it. فَرْجَهُون timor, pavor; insomnia, ut فَرْجَهُون.

فَرْجَهُون granatim.

فَرْجَهُون comminutio.

فَرْجَهُون, et melius, separa-tio, comminutio.

فَرْجَهُون, pl. فَرْجَهُون particula.

فَرْجَهُون avolans, aufugiens; mobilis, volaticus; it. com-minutus, friabilis.

فَرْجَهُون placenta oleo et melle confecta.

فَوْمَا مَهْفَنْيَا	granulatio ; avolatio, fuga.	فَوْمَا	demonstravit.
فَوْمَا نَزَفْلِيَّا	tumultus.	Ethpa. فَوْمَا	pass.
فَوْمَا مَهْفَنْيَا	pl. اَكْلَمَهْمَةْ	فَوْمَا	demonstratio.
فَوْمَا مَهْفَنْيَا	παράδειγμά, exemplar; præfatio ; demonstratio.	فَوْمَا	. . .
فَوْمَا مَهْفَنْيَا	exemplaris, exemplis illustratus.	فَوْمَا	latrina, <i>id. q.</i>
فَوْمَا مَهْفَنْيَا	indicatio, indiciorum requisitio.	فَوْمَا	visitatio ; territorium visitationi subditum.
فَوْمَا مَهْفَنْيَا	et فَوْمَا pardus, lupus cervarius, <i>cfr. ar.</i> فَهْد.	فَوْمَا	perioda, visitator.
فَوْمَا مَهْفَنْيَا	heb. כָּרְדֵּז, pers. - ar. فَرْدُوس, παράδεισος, paradisus ; hortus quicumque. فَوْمَا مَهْفَنْيَا paradisus rationalis : Ecclesia.	فَوْمَا	monitio.
فَوْمَا مَهْفَنْيَا	custos horti.	فَوْمَا	tractus littoralis, ora maritima, <i>cfr.</i>
فَوْمَا مَهْفَنْيَا	(vox præc. c. suff. pers. بَنْ possessor), custos horti, hortulanus ; paradisiacus.	فَوْمَا	قَرْبَانْيَا
فَوْمَا مَهْفَنْيَا	et فَوْمَا, chald. אַרְדָּכָרִיא, theca, capsula eucharistica ; armarium ; <i>cfr.</i> παράγρισος.	فَوْمَا	mens.
فَوْمَا مَهْفَنْيَا	et فَوْمَا, περίδικον, parietaria planta.	فَوْمَا	et فَوْمَا, قَارْبَانْيَا, παράγρισις, ingenua libertas, fiducia ; familiaritas, ratio agendi libere ; c. اَدَب adv., libere ; viva voce.
فَوْمَا مَهْفَنْيَا	παχδαλιγγές, aconitum.	فَوْمَا	فَوْمَا, libere, cum fiducia.
فَوْمَا	, pers. بَرْدَه, tentorium venatoribus inserviens.	فَوْمَا	et فَوْمَا, id. q. حَبْرَه, libere egit.
		فَوْمَا	sed usurp. c. حَبْرَه, ovis.
		فَوْمَا	προέλθωμεν, procedamus.
		فَوْمَا	πρόβατον, ovis.
		فَوْمَا	προβατική, probatica piscina.
		فَوْمَا	pl. اَكْلَمَهْمَةْ
		فَوْمَا	προβλήματα, problema, quæstiones solvendæ, quæstiones præviæ.

προγνωστικόν προγνωστικόν, prognosticum, rei futuræ signum.

latrina et λατρίνη, it. λατρίνη latrina, cfr. لَرْنَةٌ, s. لَرْنَةٌ.

prodromus πρόδρομος, prodromus.

prunum vox lat., prunum.

prima πρώτη, prima *indictio*.

propositio anterior, pl. προτάσεις, propositio anterior, praemissa.

prærogativa honorifica προτίμησις, prærogativa honorifica.

primus πρῶτος, primus.

praefectus prætorianorum, praefectus prætorianorum.

relativum nomen; spica, nardus.

practicus πρακτικός, praticus.

præsanctificatorum προηγγειαμένη, liturgia præsanctificatorum.

propositum προκείμενον, propositum.

sturnus, pl. στύρνον sturnus.

vicarius, proximus, assessor, vicarius.

prologus, et πρόλογος, prologus, præfatio.

falsa argumentatio προλογισμός, id. q. *præc.*; it. παραλογισμός, falsa argumentatio.

minister, administrator.

etc. προσέμιον, præfatio.

ante primum diem seu pridie idus, etc.

v. s. اَنْ.

غَرْبَةً φάρουγξ, γύγα, guttur.

تَابِلَارِيُّ, pers. تَابِلَارِيُّ, tabelarius, cursor.

corollarium προσθιορισμός, corollarium.

vestigalia πρόσοδος, redditus, vec-

facies πρόσωπον, facies, v. قَوْنِيْرُ.

præstans προστασία, pri-

mandatum, pl. مَدْلِعَةٍ πρόσταγμα, mandatum, edic-

atum regium.

poricus προστάτης, ἄδα, por-

lius; limen, ut بَهْرَةٌ id.

mulcta πρόστιμον, mulcta.

et προστατής, patronatus.

proselytus, advena.

attendantus πρόσχωμα, attend-

etc. προσφορητικόν, ut seq.

لِمَنْفَهُونْ وَ et rectius
لِمَنْفَهُونْ نَوْسَرْبَرْجَرْسَ ،
allocutio.

أَهْمَافُ مَهْمَافٌ προσφορά, oblatio,
sacrificium.

مُحَمَّدٌ ف προσφορικοί , prosphorici, hymni a psaltribus de-
cantandi.

porticus; limen, *cfr.* لِمَانْ .

غُصَّةٌ فِي πρόπολις, propolis,
glutinum apum.

فَمَكُّهَا , v. فِي مَكْهُونٍ .

πρόποντα pl. **πρόποντα** **πρόποντα** **πρόποντα**
potus prævius e melle et aromatibus confectus, ad acendum appetitum ante prandium.

πρόθεσις, propositio;
præpositio.

προθεσμία, tempus præfinitum; conductum, terminus conductus.

لِمَدْنَهْ وْ ad tempus pro-
tractus.

لِيْلَةُ puls dulcis amygdalis et
melle confecta.

pl. حَمَّامَاتٍ, *it. حَمَّامَةٌ*,

gaculum, cingulum lumbare ;
femoralia ; tunica.

Ethpa. ةَفْلِي v. denom., cinguo præcinctus est.

فَرْعَانٌ, *heb.* פְּרָעָן, *ar.* فَرْعَانٌ, *fer-*
rum; instrumentum ferreum
uti securis, forcipes, etc.; ea-
tenæ, vincula; vectes fer-
reæ.

فَنَكْتَلٌ et فَنَاكْمَا ferreus.

فَإِنْتَ مُهَاجِرٌ arcu ferreo armatus.

فَاحْكُمْ frustum panis.

וַיֵּלֶךְ , heb. וַיָּלֹךְ , fut. וַיִּלְךְ ;
volavit ; it. avolavit, fugit ;
properavit, ruit, spec. c. וְ ;
immissa est sagitta ; trop.
late se extendit turbo, fama,
serpsit ulcerus ; se diffudit res ;
وְאָוָלָה מִלְחָמָה וְאָוָלָה
avolavit. قَدْرَةٌ وَّقُوَّةٌ evolavit anima ejus :
obiit. Part. præs. قَدْرَةٌ , قُوَّةٌ ;
subst. usurp. v. infra. Part.
præt. قَدْرَةٌ : diffusus.

Pa. **تَسْكُن** circumvolitavit; *trop.* dissipavit *bona, vitam* perdidit.

Ethpa. ۷۱۷۲ dissipatus est.

Aph. **أَفَّ** volare fecit, vel
sivit; *trop.* sustulit, diffudit,
disseminavit.

Ettaph. اَفْلَى protrusa est
in aera avis.

لُف volatus; *trop.* cursus ve-

lox ; it. german, heb. חַרְבָּה , ar. فَرْخ .	Pa. فَتَّا assignavit, imposuit, ar. فَرْجَنْ .
فَتَّسُدًا , pl. فَتَّسُدًا volatile, avis, avicula <i>ut respa</i> , etc ; أَدْبَارًا ، فَتَّسُدًا ، penna <i>ad scribendum adhibita</i> . فَتَّسُدًا وَأَوْتَادًا avis lucis : gallus. فَتَّسُدًا وَأَمْدَنًا phœnix, avis <i>fabulosa</i> .	فَتَّسُدًا scissio. فَتَّسُدًا πειρατής , pirata, cfr. فَتَّسُدًا .
فَتَّسُدًا ad aves spectans.	فَتَّسُدًا lat., prætor.
فَتَّسُدًا volans, volatilis; <i>apud alchim.</i> , argentum vivum.	فَتَّسُدًا وَأَوْتَادًا , pl. فَتَّسُدًا وَأَوْتَادًا lat., prætorium, præfectura.
فَتَّسُدًا volatus.	فَتَّسُدًا et فَتَّسُدًا prætorianus miles.
فَتَّسُدًا prodigus ; capparis spinosa planta.	فَتَّسُدًا , corrupt. e gr. πρόθεσίς , demonstratio, exemplum.
فَتَّسُدًا prodigaliter.	فَتَّسُدًا pirum.
فَتَّسُدًا prodigalitas.	فَتَّسُدًا παράταξίς , agmen.
فَتَّسُدًا velociter.	فَتَّسُدًا هُوًا vox lat., protector, custos corporis.
فَتَّسُدًا avolare faciens ; trop. prodigus.	فَتَّسُدًا , ar. فَرْطُوسَة , proboscis, rostrum avis.
فَتَّسُدًا , pl. فَتَّسُدًا scintilla ; cancer, tumor.	فَتَّسُدًا lat., privatum aerarium imperatoris.
فَتَّسُدًا , pl. فَتَّسُدًا (compos. ex فَتَّا et ar. دُود vermīs), vespertilio ; trop. phantasma-ta, evocationes nocturnae.	فَتَّسُدًا , etc. περιόδευτής visitator, perio-deuta chorepiscopus, cfr. فَتَّسُدًا .
فَتَّسُدًا وَوَنًا vespertilioni similis.	فَتَّسُدًا et فَتَّسُدًا περιόδεια , visitatio, cfr. فَتَّسُدًا .
فَتَّسُدًا , heb. חַרְבָּה , ar. فَرْخ et فَرَص , fut. فَتَّسُدًا scidit, rupit; distraxit. Part. pass. فَتَّسָה ; it. in labio superiori fissuram habens (ar. فَرَصَة), inde blaesus. Ethpe. فَتَّسَلِ pass.	فَتَّسُدًا officium visitatoriis. فَتَّسُدًا περιόδευσις , visitatio medici.

فَنْدَمَا æstate proiecta, anus, cfr. فَنْهُمْ.

فَنْتَلَمْ succus olivarum.

فَنْمَتْ, gall. prince, princeps.

فَنْمَنْدَس πράσινος, ilex.

فَنْمَكْنَهْنَهْنَهْ πρόγραπτός, turbo, procella; meteori species.

فَنْمَفْكَهْنَهْنَهْ peripateticus, pl. فَنْمَفْكَهْنَهْنَهْ et فَنْمَفْكَهْنَهْنَهْ.

فَنْمَفْكَهْنَهْنَهْ περὶ ἐρμηνείας, de interpretatione, nomen libri Aristotelis.

فَنْمَرْ, ar. فَرَكْ, fut. فَنْمَهْ, fricuit. Part. pass. فَنْمَمْ, pl. f. فَنْمَخْدَمْ; pl. f. فَنْمَخْدَمْ perfricatae spicæ, inde absol. subst. frumentum recens, ar. فَرِيَكَةْ.

Ethpe. فَنْمَلَأْ pass.; decussus est ut folia arboris.

Pa. فَنْمَقْ comminuit, contrivit.

Ethpa. فَنْمَلَأْ pass.

Palel فَنْمَدْ denom. a فَنْدَمَا, comminuit.

Ethpalal فَنْمَلَأْ pass.

فَنْمَدْ et فَنْمَدْ comminutio.

فَنْمَدْ durus; sævus, immanis.

فَنْمَدْمَا duritas; sævities; cfr. זָרַע id., et ar. فَرَكْ odio habuit.

فَنْمَهْنَهْ nomen vestis.

فَنْهَمْدَا velum, cfr. פְּנִירֵז; it. vestis serica.

فَنْهَمْدَا nucleus qui facile aperitur.

فَنْهَمْدَا f., emph. فَنْهَمْدَا, pl. assyr. parraku, fanum, templum idolorum.

فَنْهَمْدَا pl., id.

فَنْهَمْدَا, pl. فَنْهَمْדَا mica.

فَنْهَمْدَا ut مَهْمَدْهَمْا.

فَنْهَمْدَا مَهْمَدْهَمْا friabilis.

فَنْهَمْدَا παράχυψήσα, cessatio; c. حَبَّ, cessit.

فَنْهَمْدَا vinxit, compedivit, implicavit, cfr. فَنْهَمْدَا impe-divit.

Ethpa. فَنْمَلَأْ pass.

فَنْهَمْدَا vinculum.

فَنْهَمْدَا vincio, implicatio.

فَنْهَمْدَا dissipavit; it. implicavit, commiscuit, cfr. neo-ar.

فَرْكَشْ, supplantavit.

فَنْهَمْدَا وَهْوَهْنَهْ dispersio; it., vel فَنْهَمْدَا πύργος, turris, cfr. فَنْهَمْدَا s.

فَنْهَمْدَا.

فَنْهَمْدَا προσένευτής, proxeneta, procurator.

فَنْهَمْدَا latibulum.

فَنْهَمْدَا f., πράξις, pl. فَنْهَمْدَا actio, actio juridica, lis; narratio, acta; فَنْهَمْدَا

فَهْمَةٌ liber Actuum Apostolorum.

فَهْدَهُ *f.*, manubrium, capulus.

فَهْدَهُ locus apicus, prædium, *cfr.* **فَهْمَهُهُ** et **فَهْمَهُهُ**.

فَهْكَهُهُ, *v. فَهْكَهُهُ*.

فَهْكَهُهُ, *v. فَهْكَهُهُ*.

فَهْكَهُهُ *f.* it. **فَهْكَهُهُ**, *pl.*

فَهْكَهُهُ, *f.*

παράλληλος, parallelus.

فَهْكَهُهُ *παράλληλος*, paral-

laxis stellæ *apud astronomos*.

فَهْكَهُهُ *πάραλος*, littus maris,

cfr. **فَهْكَهُهُ**.

فَهْمَهُ

فَهْمَهُ, *heb.* כָּרֶם, *ar.* فَرَمْ,

fut. نَفَّهَ scidit; *cfr.*

حَنَّ. *Part. pass.* فَهْمَهُ ; it.

trop. simus.

Ethpe. حَنَّا *pass.*

Pa. مَقْتَلٌ minutatim concidit.

Part. pass. مَقْتَلٌ ; مَقْتَلٌ

مَاتٌ مَفْتَلٌ vestes vittatae, fimbriis instructæ.

فَهْمَهُ et **فَهْمَهُ** comminutio, scissio; caries *vel* amissio dentium.

فَهْمَهُ edentulus; *cfr. ar.* أَفْرَم *id.*

فَهْلَهُ, *pers. - ar.* قَرْنَان, edictum regium.

فَهْلَهُ tintinnabulum.

فَهْلَهُ thus, thuribulum, *v. s.* *rad.* فَهْلَهُ .

فَهْمَهُهُ nodulus *vel* globulus vestis, *pl.* اِنْدَهُ.

فَهْمَهُهُ παραμυθία, consolatio.

فَهْمَهُهُ et minus recte اِنْدَهُ neolog., παραμονάριος, ædi-

tuus templi; *it.* aurifex.

فَهْنَ obesus, gulosus.

فَهْنَهُ gulositas, luxuries.

فَهْنَهُ etc., *v. s.* فَهْنَهُ.

فَهْنَهُ πρόνοια, providentia Dei.

فَهْنَهُ, *pl.* اِنْدَهُ φερνή, dos.

فَهْنَهُ παραγγελία, denuntia-

tion legalis.

فَهْنَهُهُ, pers. قَرْنَجَمَشْك, caryophyllum (*gall. giroflier*).

فَهْنَهُ et **فَهْنَهُ**, pers. بَرْجَنْهُ, et بَرْجَنْهُ metallum cyprinum.

فَهْنَهُهُ φρενίτις, phrenesis, dementia.

فَهْنَهُهُ προνομία, privilegium, immunitas.

فَهْنَهُهُ, *pl.* فَهْنَهُ, a πρόνοος providus, *inde syr.* provisor, œconomus, administrator.

Palel **فَهْنَهُ** *v. denom.*, *fut.* بَرْجَنْهُ administravit; rexit, educavit; curam gessit, sustentavit, aluit; distribuit, dispensavit, disposit *rem*; constituit, ordinavit.

Ethpalal **فَهْنَهُهُ** *pass.*; se sus-

tentavit, victum sibi comparavit.

فَهْمَةٌ, **فَهْمَنْصَهْ** administratio, gubernatio; cura, providentia, œconomia; sustentatio, commeatus, proventus; ratio agendi, acta res; territorium administrationi subditum, provincia, dioecesis.

فَهْمَنْصَهْ œconomus, dispensator, minister, curator.

فَهْمَنْصَهْ *vel* **فَهْمَنْصَهْ** dispensatore.

فَهْمَنْصَهْ administratio, providentia; œconomia divina.

فَهْمَنْصَهْ excogitator, inventor; administrator; *it. pass.*, administratus.

فَهْمَنْصَهْ administratio.

فَهْمَنْصَهْ, *v. s. هَمْ*.

فَهْمَنْصَهْ, *f. فَهْنَهْمَهْ* senex, *cfr. فَهْنَهْمَهْ*.

فَهْمَنْصَهْ senilis.

فَهْمَنْصَهْ ætas senilis.

فَهْمَهْ, *heb. פְּנַח*, *ar. فَرَش*, *fut. فَهْمَهْ* extendit, expandit manus, alas, etc.; stravit, exposuit librum; *trop.* aperuit mentem; *it. diffudit*, dispersit, *cfr. ar. فَرَس* *et heb. פְּנַח*; *it. intr.*, expansus est, se extendit, se diffudit. *Part. pass.*

فَهْمَهْ; *it. divisus; active usurp., extendens.* **فَهْمَهْ** patet seu instat certamen; *subst v. infra.*

Ethpe. **فَهْلِي** *pass. et refl.*

Pa. **فَهْمَهْ** expandit.

Ethpa. **فَهْلِي** *pass. et refl. ; c. al. sensu, v. s. هَمْ*.

Pali. **فَهْمَهْ** patefecit, in publicum exprompsit, evulgavit, personam detexit, rem secretam enudavit, *inde trop.*, opprobriis affectit. *Part. pass.*

فَهْمَهْ; *adj. turpis.* *Ethpali.* **فَهْلِي** *pass. Part. فَهْمَهْ*; *adj. turpis.*

فَهْمَهْ, *pl. فَهْمَهْ* operculum, velum, spec. calicis; stratum, stragulum, *ar. فَرَاش*; id quod apponitur, portio cibi, cibus; *in pl. conus cedri.*

فَهْمَهْ extense.

فَهْمَهْ, **فَهْمَهْ** velum, operimentum, pannus.

فَهْمَهْ vestis sacerdotalis: pallium, tunica.

فَهْمَهْ, *pl. فَهْمَهْ* placenta panis, spec. hostia eucharistica; **فَهْمَهْ**, **فَهْمَهْ** *id. ; it. pallium; stratum.*

فَهْمَهْ, *v. هَمْ*.

فَهْمَهْ patefactio; denudatio; ignominia; pudenda.

فَنْهَا, emph. فَنْهَمْا, pl. فَنْهَمْا et إِلَّا فَنْهَمْا ungula, planta pedis, v. seq.; it. vel إِلَّا فَنْهَمْا περσέα, persica arbor; conus pini vel cedri.

فَنْهَمْا ungulis praeditus; it., ar. فَرِيزِين, ungula.

فَنْهَمْا ئِلَّا فَنْهَمْا ratio agendi; consilium; fraus, machinatio.

فَنْهَمْا, مَدْنَهْمَهْ extensio.

فَنْهَمْا nude.

فَنْهَمْا denudatio; prostitutio.

فَنْهَمْا diffamator.

فَنْهَمْا denudatio.

فَنْهَمْا detegendus.

فَنْهَمْا detectio.

فَنْهَمْا πόρος, emph. فَنْهَمْا, pl. فَنْهَمْا via agendi, modus; propositum, consilium; effugium; dolus, machinatio, nq. in hoc sensu فَنْهَمْا بِسْعَهْمَهْ ; فَنْهَمْا captio-

nes sophisticæ; adverbialiter: دَفْهَمْا aliquo modo. فَنْهَمْا vel حَلَّا فَنْهَمْا, مُمْلَأَ فَنْهَمْا, مُسْكَلَفْهَمْا omnimode, omnino. حَسْبَهْ فَنْهَمْا aliquo modo, فَنْهَمْا necessario; it. locutiones

varias efformat. كَهْمَهْ وَ فَنْهَمْا وَ لَمْ كَهْمَهْ وَ fieri potest. لَمْ كَهْمَهْ وَ ne-

quit fieri; كَهْمَهْ مَهْ non est ei effugium ab hac re: fieri non potest quin; non potest esse sine, seu fieri nequit, ar. (لَا بَدْ مِنْ). لَمْ كَهْمَهْ مَهْ fieri nequit quin illum videam.

Ethpa. فَنْهَمْا verb. denom., excogitavit, rei providit, studuit, paravit; commentus est, machinatus est; c. al. sensu v. s. فَنْهَمْا.

فَهْهَمْهَ provide, callide.

فَهْهَمْهَ providens.

فَهْهَمْهَ ut seq.

فَهْهَمْهَ فَهْهَمْهَ, فَهْهَمْهَ callidus.

فَهْهَمْهَ دُولُس, machinatio, insidiae.

فَهْهَمْهَ مَهْ inventor, cfr. مَهْ فَهْهَمْهَ.

فَهْهَمْهَ, pers. قَرْسَنْك, ar. قَرْسَنْخ, parasanga.

فَهْهَمْهَ προστάξ, porticus, cfr. فَهْهَمْهَ.

فَهْهَمْهَ προσταγμα, mandatum.

فَهْهَمْهَ προστειον, prædium.

فَهْهَمْهَ, pers. آبرستار, famula, abra, cfr. مَهْ فَهْهَمْهَ.

فَهْهَمْهَ πράσιον, marrubium planta.

فَهْهَمْهَ πράσιوς, prasinus; it. nomen factioñis circensis, e

*colore viridi qua induebatur
desumptum.*

عَصْفَنْ, fut. عَصْفَنْ disten-
dit, rarefecit; cfr. عَصْفَنْ .

Ethpalp. عَصْفَنْ pass.

عَهْدَنْ attenuatio, dissolutio;
res attenuata.

عَهْدَنْ, pl. قَتَمَهْدَنْ ungula;
forceps *cancri*.

عَهْدَنْ مِنْعَهْدَنْا ut

عَهْدَنْ, pl. قَتَمَهْدَنْ et مُنْعَهْدَنْ pers.
پَرْسَةَ , ancilla, cfr.
عَهْدَنْ .

عَهْدَنْ, pers. فَرِستَكْ , manda-
tum regis.

عَهْنَ, ar. فَرَعْ , fut. عَهْنَ
germinavit; folia vel fructus
produxit, *absol. vel seq.* عَهْنَ ,
فَلَوْ ; denudavit seu rasit
caput; it. fut. عَهْنَ , heb.

عَدْنَ, ar. فَرَغْ , solvit debitum,
retribuit *c. acc. pers. et rei*;
respondit; exsecutus est *jus-
sum*, persolvit *officia*, absolu-
vit *rem*; *intrans.*, desiit. عَهْنَ

عَهْنَ et مَهْدَنْ debita
solvit. حَجَّةَنْ حَسْنَ Deus ei justam delictorum
poenam retribuit. Part. pass.
عَهْنَ ; subst. amurca.

Ethpe. عَهْنَ pass.; retribu-

tionem accepit, *inde* remuneratus est, punitus est; retributionem sibi sumpsit, *inde* ultus est; *absol. vel seq.* عَهْنَ debitum accepit. أَفَرَأَيْتَ نَبِرْ وَأَفَرَأَيْتَ نَبِرْ votum persolvit.

Aph. عَهْنَ , ar. أَفَرَأَيْتَ germina emisit; *trop.* protulit, scatuvit *fons*, crevit *res*; it. germinare fecit. مَهْدَنْ عَهْنَ præmia comparavit.

عَهْنَ fructus; retributio.

عَهْنَ germen, flos, ramus, ar.
قرء ; *trop.* progenies; it. ultio;
gramm. derivatum nomen;
it. hypericon planta.

عَهْنَ retributio, solutio *debiti*;
remuneratio, vindicta, poena; ap. gramm.
apodosis seu propositio consequens. مَهْدَنْ وَعَهْنَ dies
retributionis: judicium.

عَهْنَ retributio; remunera-
tio, vindicta; apud gramm.,
عَهْنَ .

عَهْنَ retribuens, vindictam
sumens.

عَهْنَ retributio, responsio.

عَهْنَ denudatio seu tonsio
capitis.

عَهْنَ ap. gramm., derivatus.

عَهْنَ germina, flores habens
vel producens; retribuens.

رِسْمٌ دُّنْدَلْجَانْ renumeratio.

جُنْدَقْ quod solvi, retribui potest, solvendus.

سُرْنَسْ, pl. سُرْنَاتْ sturnus.

فَحْمَنْتُ *adject. deriv. a nom.*

فَرَّأَوْ Pharao, *inde superbus,*
cru delis.

Ethpalal. ئەپالا v. denom., uti
Pharao superbivit.

فُلْفَةٌ، لِفْلَفٌ πόρπη, fibula, annulus : funis.

فردقه، *pers.* ;
portulaca (*gall. pourpier.*)

مِقَادِيقٌ mica panis.

٦٥

erum; v. deriv. s. 49.

πρόπολις, glutinum apum.

فَرْكَدٌ pennæ, plumæ.
فَرْكَدُسٌ præpositus, præfec-
tus.

وَقَدْ movit digitos abluedos,
os gargarizatione abluit ; it.
recreavit.

Ethpa. ﻭ، ﻕلٰ se oblectavit,
recreatus est.

فَهُدًا et **فَهْلًا** motus; circum-
vagatio: deliciae, luxuria.

فَرْفَرٌ v. s. **فَرْفَرٌ**.

لُفْ lascivus.

فَزْدٌ f., it., فَزْدٌ vel افْزَدٌ uva passa, granum mali punici.

atomus.

فَزْهُقْ فَزْهُقْ πρόσωπον, facies, vul-
tus, *per extens.* homo, perso-
na; Persona Christi; super-
ficies, effigies, prætextus;
significatio; gramm. forma
vocis, persona. حَقْرَنْهُقْ in pro-
pria persona, ipse. هَقْرَنْهُقْ لَكْ
حَبْ وَكْدَا se crucis signo
munivit. مَهْ فَزْهُقْ facie ad
faciem; coram aliquo vel ali-
qua re. مَهْ فَزْهُقْ ؟ nomine
alicujus. وَهْ وَهْ حَقْرَنْهُقْ
كَلْمَهْ وَهْ claustum morbi præ-
textu deseruit.

فَنْزِهُقْتَ personalis; gramm.,
pronomen personale, ad per-
sonas spectans.

۷۰۹ فَ facie ad faciem.

فِي هَذِهِ قُرْآنٍ personaliter.

فُرْقَةٌ, *heb.* פְּרָקָה, *ar.* فَرَقَةٌ, *fut.*

۵۰ فَ se separavit, discessit;
 trans. separavit, removit,
 spec. eripuit *a malo*; servav-
 it, redemit. Part. act. فَتْ ;
 emph. فَمَا liberans; subst.
 salvator. Part. pass. فَعَلَهُ
 liberatus; salvus. حَمَنْ وَحَمَدْ

حَبْدَةٌ ovis Dei sanguine redempta.

Ethpe. **فَهْنَكْ** separatus est, discessit; liberatus est; redemptus est.

Pa. **فَهْنَكْ** amovit, abstulit; disjunxit, seposuit; lacervit; rem curavit; **لَا حَفْنَكْ** non studens vanitatis.

Ethpa. **فَهْنَكْ** amotus est, disjunctus est, se separavit; se liberavit, se excusavit.

Aph. **فَهْنَكْ** disjunxit; semovit, abegit; subduxit, ad se seorsum vocavit. **فَهْنَكْ هَنْكَهْ** eos ab invicem sejunxit.

حَمْ separatio, divisio; **حَمْ** locus separationis, commissura.

فَنْمَ pannus; bombycinum. **فَنْمَ وَحْنَمَ** linteum. **فَنْمَ وَحْنَمَ** lanæ fragmentum.

فَنْمَ dim.. panniculus. **فَنْمَ** pars posterior cervicis; vertebræ, *cfr.* **فَنْمَ** et ar.

فَنْمَ liberatio, salus; redemptionis, redemp-

tionis pretium.

فَنْمَ salutaris.

فَنْمَ, **فَنْمَ**, pl. f. liberator, defensor; Redemp-

tor.

فَنْمَ liberatio.

فَنْمَ, ad Redemptorem pertinens; salutaris.

فَنْمَ disjunctio, divisio; **حَبْ** **فَنْمَ** digressus est, scissionem fecit.

فَنْمَ, **فَنْمَ** separatus, distans, remotus.

فَنْمَ distantia.

فَنْمَ seorsim, procul.

فَنْمَ disjunctio.

فَنْمَ separans, sejungens.

فَنْمَ separatio, disjunction.

فَنْمَ saluti obnoxius.

فَنْبِ se volutavit; supinus cecidit.

فَنْمَنْ, pers. پارگین, fossa, aqueductus; cloaca; *cfr.* **فَنْمَنْ**.

فَنْمَنْ lat., procuratio; **حَبْ** **فَنْمَنْ** procurandam dedit hæreditatem.

فَنْمَ, pl. **فَنْمَ** **قَانْجَانَهْ**, cancelli, septum cancellatum.

فَنْمَ **πρακτικός**, practicus; *it.* praxis, actio.

فَنْمَ **πρακτική**, pragmatica *epistola*.

فَنْمَ **πρακτικός** et **فَنْمَ** **πρακτικός**, óv., practicus; strenuus.

فَنْمَ practicus.

فَرْمَق πράκτηρ, πράκτωρ, collector vectigalium, exactor.

فَرْمَنْدَه παρακινητής, perturbator, factiosus.

فَرْمَسْهُ, **فَرْمَسْهُ**, **فَرْمَسْهُ** vox lat. processus, unde neolog. gr. πρόκενσος, processus seu pompa regia; lustratio regis extra urbem regiam.

فَرْمَدْهَا, **فَرْمَدْهَا**, **فَرْمَدْهَا** παράκλητος, consolator, advocatus; inde Paracletus, Spiritus Sanctus.

فَرْمَكْهُ a Paracleto veniens.

فَرْمَهَا turris, vide **لَوْهَ**.

فَرْمَهُ, ar. فَرَقَ, strepuit, sonum edidit, cfr. **فَهَ**.

Ethpalpal **فَرْمَلَ** fissus est.

فَرْ, ar. فَرَ, fut. **فَخَهُ** fugit. Palp. **فَنْفَ**, ar. فَرَقَ, agitavit, alas motitavit avis; gargarizavit; animam singultavit moriens.

Ethpalp. **فَنْفَ** pass. et refl.; it. ut Palp., singultum edidit moriens.

فَهَهَ agitatio; singultus morientis.

فَهَهَ, pl. **فَهَهَ** ignis flamma e fornace erumpens.

فَهَهَ porphura, ut **لَوْ**; in pl. perdices.

فَلَّا, f. لَّا et **فَلَّا**, pl. لَّا et **فَلَّا**, agnus, ovis.

فَلَّا, v. s. **فَلَّا**.

لَّا, v. ibid.

فَلَّهُ pons, pergula; polenta. **فَلَّهُ** et **فَلَّهُ** debilis mente, stultus.

فَلَّهُ vox gall. frère, Hospitarius frater.

فَلَّهُمَّ Fratres Minores Ordinis S. Francisci.

فَلَّهُ, heb. שָׁרֵךְ, fut. **فَلَّهُ**, separavit, secrevit, selegit, addixit rem personæ, inde obtulit Deo votum, etc.; it. discrevit, distinxit, intellexit; constituit, assignavit; definit, decrevit; c. **فَلَّ**, disjunct, inde trop. excommunicavit; violavit mandatum; intrans. divisus est, se separavit, discessit; secessit; trop. obiit; seq. al. verbo aequivalat adverb. clare, distinete: **فَلَّهُ** luculenter demonstravit. **فَلَّهُ** nomen Dei impie usurpavit seu pronuntiavit. **فَلَّهُ** نَعْمَهُ حَفَّهُ حَسَنًا **فَلَّهُ** se ad opus vanum addixit. Part. pass. **فَلَّهُ**, **فَلَّهُ**; adject., distinctus, diversus, specialis; **فَلَّهُ** حَتَّى

natura diversi. فِنْمَعْ مُدْ سَبِّبُوا inter se discrepantes ; trop. egregius, excellens, nobilis. فِنْمَدْهَا وَمَدْخَمَا optimates regni ; subst. Phariseus ; f. فِنْمَعَا ; subst. quod ad sacrificium seponitur, sacrificium ipsum ; pl. f. فِنْمَعَا mirabilia.

Ethpe. اَفَتَرَأَنَا pass. et refl. ; it. discessit. حَدَّمَهُمْ اَنْجَلِي selecti fuimus ad ministerium Ecclesiae. اَفَلَمْ اَنْجَلِي distinctus est ejus locus : ad dignitatem promotus est, honore insignitus est. اَنْجَلِي بِلْ مَدْفَعَةٌ مُسْكَنٌ plumbum quod ab argento non discrepat.

Pa. فِنْ divisit, distinxit, separavit ; selegit, discrevit ; dijudicavit, inde interpretatus est. *Part.* pass. مَفْنَمْ , مَفْنَمْ ; adj., distinctus, varius ; specialis. اَنْجَلِي كُفْ وَمَفْنَمْ evangelium quatuor evangelistarum separatim digestorum, per oppos. ad اَنْجَلِي كُفْ وَمَشْكُنْها διὰ τεσσάρων , seu evangelium quatuor Evangelistarum in unam narrationem continuam commixtorum ; gramm., pronomen separatum seu non affixum ; it.

اَنْجَلِي كُفْ vel اَنْجَلِي كُفْ وَمَفْنَمْ Evangeliarium seu lectiones ex evangeliis pro quovis anni die.

Ethpa. اَفَقَدْنَا pass.

Aph. اَفَقَدْنَا separavit, selegit ; inde obtulit, distribuit ; it. confregit cor.

فَهَوْمَنَا , pl. فَهَوْمَنَا separatio, disjunctio; abscissio, divisio, distributio ; pars cultui Dei vel alterius reservata, inde oblatio, sacrificium ; portio, donum ; panis, spec. eucharisticus, inde ar. بُرْخَان ; trop. distinctio, definitio ; discretiva vis, judicium ; excellentia ; it. discessus, mors; apud logicos differentia specifica ; species, modus. فَهَوْمَنَا ، مَفْعَةً labiorum distinctio : verborum prolatio. كُفْ فَهَوْمَنَا وَهَنَا دَبْحَنَا كُخْ quodnam interest discriben cordis inter et mentis puritatem ? كَهَنْدَا فَهَوْمَنَا quotuplici modo ? ; it. adverb. كَهَنْدَا وَكَهَنْدَا seorsim. اَمْ وَكَهَنْدَا per modum distinctionis. كَهَنْدَا ordine digestus.

فَهَوْمَنَا separatio ; excommuniciatio ; abrenuntiatio, discessio ; differentia.

فَعْل	selectio ; stimulus bulbici.	فَعْل	equitatus ; equitum pugna.
فَعْل	discretio ; oblatio.	مَفْعُول	separate, distinete, varie, speciatim.
فَعْل	فَعْل ، فَعْل	فَعْل	separatio.
فَعْل	separatio, distinctio ; divortium ; explicatio	مَفْعُول	separans, discernens ; interpres ; interpretationi proprius.
فَعْل	distincta ; selectio.	مَفْعُول	vis discretiva.
فَعْل	فَعْل selectio lectionum.	مَفْعُول	separabilis ; separatus ; eximius.
فَعْل	فَعْل distinctio capitum : libri index.	مَفْعُول	separatim.
فَعْل	separans, dividens ; trop. discernens, prudens ; illustris.	مَفْعُول	divisio ; مَفْعُول indivisibilitas, inseparabilitas.
فَعْل	نَفْعُوا anima rationalis.	مَفْعُول	vox pers., heb. pl. فَعْل exemplar ; index ; tabula astronomica ; فَعْل divinae Litteræ.
فَعْل	مَبْخَارُ فَعْل signum characteristicum ; apud gramm., حُكْمُ فَعْل puncta diacritica	مَفْعُول	divaricatio crurium, cfr. ar. فَرَشَة divaricavit.
فَعْل	sensum determinantia ; it. verborum distinctioni inseriens vocalis vel accentus.	مَفْعُول	distortis cruribus incessit.
فَعْل	نَمَاء nomen Dei incomunicabile, cfr. neo-hebr. שֵׁם מִפְרַשׁ .	فَعْل	furcosa ungula animalium ; cfr. فَعْل et فَعْل aurifex.
فَعْل	فَعْل distincte ; prudenter.	فَعْل	
فَعْل	فَعْل distinctio ; vis discretiva ; judicium, prudentia, peritia, excellentia, titulus dignitatis ; لَا فَعْل insipientia, defectus judicii.	فَعْل	, ar. فَرَث fut. لَوْه fudit, id. q. usitat. Pa.
فَعْل	فَعْل distincte, separatim.	Ethpe.	لَاقِل disruptus est ; evisceratus est ; crepuit ; trop. لَاقِل حَسْلَادِ ira percitus est.
فَعْل	فَعْل distinctio ; separatio.		
فَعْل	فَعْل ut فَعْل pharisaeus ; it. adj., pharisaicus.		
فَعْل	فَعْل , pl. فَعْل et فَعْل , heb. شَدَّ , ar. قَارِس , eques.		

<i>Pa.</i> فَرْقَدْ diffidit, discerpst; evisceravit; <i>trop.</i> castigavit.	فَتَاهُمْ in pl., particulæ metallicæ, lamellæ.
<i>Ethpa.</i> فَرْقَلْ pass.	فَنَانِهِسْ et فَلَانِهِسْ, virgo.
<i>Aph.</i> فَرْقَلْ discerpst.	فَنَامِنَهِسْ فَنَامِنَهِسْ παρθένιος, parthenium planta.
<i>Pali</i> فَرْقَلْ discerpst, laceravit.	فَنَاسِهِسْ virginalis.
<i>Ethpali</i> فَرْقَلْ pass.; it. fructificavit, cfr. فَرْقَلْ.	فَنَامِهِسْ f., it. فَنَامِهِسْ et فَنَامِهِسْ pl. παρθένιος, depositum.
فَرْقَة dissectio, frustum panis; it. productio, a rad. فَرْقَة.	فَنَامِهِسْ παρθένιος, depositum.
فَرْقَة ruptura, evisceratio.	فَهْوَاجِنْ pulex; cfr. <i>œthiop.</i> , ar. بَرْغُوث et بَرْغَش, heb. בְּרַגְשׁ. אָזְדָּא וְפֵהָחָתָא. psyllium planta.
فَرْقَة, ar. فَرْث. firmus; podex; it. ut seq.	
فَرْقَة dissectio, comminutio.	
فَرْقَة, v. s. فَرْقَة.	
فَرْقَة, m., pl. فَرْقَاتْ dim., frustum panis, mica.	فَهْمَى, فَهْمَى mutilus; mancus, scæva; cfr. חֲלֵד claudicavit.
فَرْقَة, مُفَرْقَة comminutio.	فَهْמָנָה claudicando.
فَرْقَة comminuit.	فَهْמָנָה claudicatio, paralysis manuum.
<i>Ethpal</i> فَرْقَلْ pass.; trop. dolore contritus est.	فَهْمَى avena, lathyris; et communius فَهْمَى pers.
فَرْقَة mente divisus est, hæsitauit, ut usitat. seq.; cfr. فَرْقَة.	فَهْمَى obolus; دَبَّشْ ungula bifida caprorum.
<i>Ethpa.</i> فَرْقَلْ dubitavit; sollicite rei studuit, c. س.	
فَرْقَة dubitatio, anxietas; in pl. فَرْقَة, al. فَرْقَة, metalli paleæ (gall. paillettes).	فَهْمَى, ar. فَهْمَى, fut. discerpst, divulsit, secuit; remisit, c. حِلْمٌ rei; it. prosiliuit, cfr. neo-ar. فَهْمَى id. Part. pass. فَهْمَى, فَهْمَى mutilus, cfr. فَهْمَى; remissus, facilis; subst., ut فَهْمَى, obolus.
فَرْقَة minutum quid, frustum panis, mica.	

Ethpe. فَعْلٌ pass. ; trop. lassus fuit ; ira dissectus est.

Pa. فَعْلٌ minutatim concidit, discepsit; disrupt; luxavit; cfr. *Pi. v.* פְּשָׁע.

Ethpa. فَعْلٌ pass.; trop. turbatus est; dubius hæsit.

فَعْلٌ sectio; secta, turma.

فَعْلٌ ramorum dissectio; manipulus frumenti.

فَعْلٌ luxatio, divulsio; pl. aestus maris.

فَعْلٌ remissio.

فَعْلٌ, cfr. *heb.* פְּשָׁע, *ar.* فَعَلَ, fut. فَعَلَّ extendit, distendit; diffudit, expandit manus, etc; inde obtulit; seq. فَعَدَ se erexit; se obtulit; extricavit, solvit, dilatavit; intr., dilatus est, crevit; se extendit, inde incessit. *Part.* pass. فَعْلٌ extensus; liturgice, erectus sacerdos, oppos. ad فَعَلَ incurvatus; فَعْلٌ manus extensa: liberalis; adj. rectus, planus; trop. simplex, incompositus; merus, sincereus, ingenuus; vulgaris, communis; rudis, plebeius, ar. فَعَلَّ; فَعَلَّ medicaamenta simplicia.

فَعْلٌ مُمْدِلاً فَعْلٌ oratio simplex: prosa. فَعْلٌ مُمْكِنًا فَعْلٌ editio

Peschito: versio simplex

Scripturæ. فَعْلٌ فَعَلَّوْا tomi versionem simplicem continentes; gramm., فَعْلٌ nomen primitivum. فَعْلٌ مُسْتَأْنِدًا فَعَلَّ numerus cardinalis. فَعْلٌ

فَعْلٌ verbum intransitivum; subst. obolus; it. nomen hymni; pl. indocti viri, vulgus; f. emph. et subst. فَعْلٌ ramulus.

Ethpe. فَعْلٌ pass. et refl.; it. progressus est ad locum, c. ﴿; trop. se diffudit; familiariter egit.

Pa. فَعْلٌ expandit, extendit.

Ethpa. فَعْلٌ pass. et refl.; se erexit. فَعَلَّوْا فَعَلَّا فَعَلَّا patuit eis via.

فَعْلٌ extensio; simplicitas; f. emph. فَعْلٌ, pl. فَعَلَّات extensiones, seu orationes liturgice a sacerdote brachiis extensis recitatae.

فَعَلَّات simpliciter; insulse; it. ingenu, confidenter; generatim, absolute; مُعَلَّهٌ فَعَلَّات rectus stetit.

فَعْلٌ extensio; simplicitas, status rei incompositæ; trop. prosa; insulsitas.

۱۰۰ قُعْدَةٌ <i>ut</i> مَقْعِدَةً .	۱۰۰ قُمْحَلَةٌ contorsio crurium, implicatio.
۱۰۰ مَقْعُدٌ extendens, erigens.	
۱۰۰ مَقْدُنٌ late patens.	
۱۰۰ قَمْهَشَةٌ fasciae.	
۱۰۰ قَعْدَةٌ , fut. قَعْدَةٌ dubitavit ;	۱۰۰ تَقْعِيدٌ torsit, implicavit, nevit, cfr. ۱۰۰ ;
۱۰۰ قَعْدَةٌ dubius hæsit. قَعْدَةٌ in tricis fuit.	۱۰۰ خَامِتَةٌ it. coxit, cfr. ۱۰۰ .
۱۰۰ قَعْدَةٌ ; Part. præt. قَعْدَةٌ; compres-	Ethpe. ۱۰۰ pass.
sus.	Pa. ۱۰۰ nevit.
۱۰۰ قَعْدَةٌ dubitationem injecit, hæsitare fecit. Part. قَعْدَةٌ ,	Etpha. ۱۰۰ pass. ; it. coctus est.
۱۰۰ مَقْعُدٌ ; anceps, perplexus, animum despondens.	Aph. ۱۰۰ torsit, contorsit ; constrinxit ; festinavit.
۱۰۰ إِقْفَأَةٌ perplexus fuit, dubitavit ; dubia fuit res.	Ettaph. ۱۰۰ netus est.
۱۰۰ قَعْدَةٌ , قَعْدَةٌ dubitatio, angustiae, suspicio. قَعْدَةٌ أَمْبَاتٌ complosio manuum præ terrore vel desperatione ; inde obstupefactio, incertitudo, animi terror.	Ethpaial ۱۰۰ contortus est ; decoctus est.
۱۰۰ قَعْدَةٌ dubitativus ; ap. gramm., dubitativa <i>particula</i> .	۱۰۰ قَمْلَةٌ torsio fili, ipsum filum, textura ; assatio, decoctio.
۱۰۰ قَعْدَةٌ , قَعْدَةٌ palma, spithama.	۱۰۰ قَمْلَةٌ contorsio ; claudicatio.
۱۰۰ قَعْدَةٌ ut مَقْعَدٌ, dubiosus, æquivocus.	۱۰۰ قَعْدَةٌ insipidus, cfr. ۱۰۰ indigestus.
۱۰۰ مَقْعَدَةٌ dubie. مَقْعَدَةٌ مَقْعَدَةٌ sine dubio.	۱۰۰ قَعْدَةٌ , it. ۱۰۰ pl. et مَقْعَدَةٌ ephippium, clitelæ (gall. bât) ; panni detriti.
۱۰۰ قَعْدَةٌ torsit, implicavit. Part. مَقْعَدَةٌ ; adj. cruribus distortus, cfr. neo - ar. مَقْعَدَةٌ .	۱۰۰ قَعْدَةٌ inus., cfr. ar. ۱۰۰ insipidus fuit cibus. Part. pass.
	۱۰۰ قَعْدَةٌ tepidus ; insipidus ; pl. f. قَعْدَةٌ ; subst. ova semi-cocta.
	Ethpa. ۱۰۰ insulsus, insipidus inventus est.
	۱۰۰ قَعْدَةٌ insipidus, insulsus.
	۱۰۰ قَعْدَةٌ insipiditas.

فِعْلَةُ pediculi avium.

فِعْلَاتُ, pl. **فِعْلَاتٍ**, it. c. *aleph prosth.* **فِعْلَاتٌ**, ar. **فَسَّافَسٌ**, cimex.

فِعْلَةٌ portula in magno ostio.

فِعْلَةٌ, fut. **فِعْلَةً** explanavit, *parum usit. in Pe. ; Part. pass.* **فِعْلَةً**; *adject. usurp.*, facilis, planus, perius; it. distinctus. **فِعْلَةً** nobis integrum erat. **فِعْلَةً** verbis ingenuis; **فِعْلَةً** *vir egregiae indolis; gramm.* **فِعْلَةً**, vocalis (**فِعْلَةً**) *apud Syros Orientales.*

Ethpe. **فِعْلَةً** facilis fuit.

Pa. **فِعْلَةً** explanavit, interpretatus est; transtulit *a lingua in alteram.*

Ethpe. **فِعْلَةً** pass.

فِعْلَةٌ, **فِعْلَاتٌ** explicatio, expeditio; interpretatio, commentator; translatio *ex uno idiomate in aliud.*; **فِعْلَةً** inexplicabilis, ineffabilis. **فِعْلَةٌ** et **فِعْلَةً** **فِعْلَةً** lexicon.

فِعْلَةً explanatorius.

فِعْلَةً facile, aperte, distinete, palam.

فِعْلَةً, **فِعْلَاتً** facilitas, copia, venia; **فِعْلَةً** facile, expedite.

فِعْلَةً, **فِعْلَاتٍ** interpres.

فِعْلَاتٌ explanans; interpres, commentator; ap. gramm., explanatoria *particula.*

فِعْلَةً facile.

فِعْلَاتً explanatio.

فِعْلَاتٌ explicabilis, explanatus facilis, comprehensibilis.

فِعْلَاتً *adv.; c. ۰*, ineffabiliter.

فِعْلَةً mutilatio, cfr. **فَحْشَةً**.

فِعْلَةً, heb. **פָּהָר**, ar. **فَكَرَ**, solvit, dissolvit, trop. *enigma-ta* enodavit, *inde* interpretatus est *somnia*; it. maturavit, emollivit, *cibum* digessit; *in-trans.*, se dissolvit.

Ethpe. **فِعْلَةً** pass. et refl.; deficit, evanuit.

Pa. **فِعْلَةً** dissolvit, resolvit, liquefecit; trop. interpretatus est, ar. **فَسَرَ**; it. liquefecit, deficere fecit; trop. sedavit iram.

Ethpa. **فِعْلَةً** pass. et refl.

Aph. **فِعْلَةً** dissolvit; interpretatus est.

Ettaph. **فِعْلَةً** urinam emisit.

فِعْلَةً solutio; liquefactio, molitices; digestio; interpretatio; **فِعْلَةً** *liquefactio cordis*: terror animi.

فَهْمَنَا interpretatio.

فَعَدْهُوا solvens, *inde* somniorum interpres; dijudicans; *it.* solutivus, digestivus; tepidus, *inde* insulsus, vanus.

فَعَدْهُوْهَا ineptiae.

فَعَنْهَا, emph. **فَعَنْلِي**, urina; urinatorum medicamentum.

فَعْنَهَا, **فَعْنَهُ** stultus, garrulus, *neo-*ar. فَشَار.

فَعَنْهُنَا liquefaciens.

فَعَنْهُنَّا tabescens; solutivus.

فَعَنْهُنَّهُنَا solutio, liquefactio.

فَعَنْلِي urina; **حُدْهُ لَفَعَنْهُهُ** latrina.

فَعَنْهُنَا obolus; *cfr.* **فَعَنْهَا** et **فَعَنْهُنَا**.

فَلَمَّا فَعَنْهُنَّهُ et **فَلَامَّا فَعَنْهُنَّهُ**, vox pers. فاشرستين, *vitis alba.*

فَعَنْهُ dissolvit, *inusit.*, *cfr.* ar. فَتَ detumuit *plaga.*

Ethpa. **فَلَمَّا** dissolutus est.

Aph. **فَقَبَ** dissolvit.

Pau. **فَهْمَنَا** dissolvit; *lanam* divisit *seu* carminavit.

Ethpau. **فَأَفَهَمَ** pass.; in vaporrem resolutus est; detumuit *ulcus.*

فَهْمَنَا dissolutio, evaporatio.

فَهْمَكَا, ar. بَيْسَة, edulium emelle, oleo et farina confectum.

فَهْمَهْمَنَا dissolutivus.

لَاتِه *et* **لَهْ**, fut. **لَهْدَا** latus fuit. Part. *præt.* **لَهْ**, **لَهْدَا**, f. emph. **لَهْمَهْدَا**; pl. emph. **لَهْمَتِه**, f. **لَهْمَتِه** latus, vastus; abundans, prolixus;

gramm., amplus sonus.

Pa. **لَهْ** dilatavit, ditavit; fuse dixit *vel* scripsit *de re.*

Ethpa. **لَهْلَهْلَ** pass. *et* rest; trop. se relaxavit.

Aph. **لَهْلَهْلَ** dilatavit; prolixus fuit.

لَهْلَهْلَ a rad. **لَهْ**, opportunitas, mora.

لَهْلَهْلَ amplitudo.

لَهْلَهْلَ, pl. **لَهْلَهْلَ** latitudo; **لَهْلَهْلَ** mansiones cœlestes; adverb. **لَهْلَهْلَ** transverse.

لَهْلَهْلَ, v. **لَهْلَهْلَ**.

لَهْلَهْلَ late, ample, fuse.

لَهْلَهْلَ latitudo.

لَهْلَهْلَ latus, amplius.

لَهْلَهْلَ latitudinalis.

لَهْلَهْلَ latitudo.

لَهْلَهْلَ amplificans.

لَهْلَهْلَ dilatatio.

لَهْلَهْلَ *لَهْلَهْلَ* ut **لَهْلَهْلَ**.

لَهْلَهْلَ, **لَهْلَهْلَ**, vox pers., verbum, dictum, (*id. quod heb.* דְּבָרִים); responsum, ratio;

per extens. res ipsa ; aliquid ; *it.* phrasis, sententia, membrum versus ; *in pl.* acta, gesta. **لَعْنَهُ فِي نُولُمْ** *nullum verbum* : *nihil* ; **لَعْنَهُ فِي هُدْوَهُ** *vel* **لَعْنَهُ فِي لَعْنَهُ** *responsum* ; *liturgice*, responsorium, antiphona ; hemistichium, pes versus *in poesi*. **لَعْنَهُ فِي هُدْوَهُ** *vel* **لَعْنَهُ فِي هُدْوَهُ** *decem verba* : Decalogus. **فِي لَعْنَهُ وَشَنْتَنْ** *res controversa*. **لَعْنَهُ فِي هُدْوَهُ** *et* **لَعْنَهُ** *responsum de-
dit*, respondit ; rationem reddidit. **لَعْنَهُ** *v. denom.*, verba dixit, respondit.

لَعْنَهُ, *heb.* לְעָנָה, *ar.* لَعْنَهُ, *fut.* لَعْنَهُ *et rarius* لَعْنَهُ *aperuit* ; *inde expugnavit ur-
bem* ; *gramm.* vocali (*✓ seu
⋮*) litteram instruxit ; *in-
trans.*, patuit. **لَعْنَهُ أَمْبَوْهُ** *manus aperuit* : liberalis fuit. **لَعْنَهُ** *epistole signum* resignavit. **لَعْنَهُ** *ferrum oculum aperuit* : vivo-
do colore tinctum est. **لَعْنَهُ** *مَحْمَدَهُ وَمَدَّهُ* baptismum insti-
tuit. **لَعْنَهُ** *مَهْمَتَهُ* visum caecis restituit ; *trop.* **لَعْنَهُ** ; **لَعْنَهُ** apertura.

intellectum aperuit : mentem elucida vit. **لَعْنَهُ** *sensus aperuit* : percepit. *Part.* *pass.* **لَعْنَهُ** ; *videns*, *per oppos.* *ad* **لَعْنَهُ** ; *adject.* *patens* ; *gramm.*, *vocalis* (*✓*) instructa *littera*; *in pl. subst.*, litteræ *testimoniales*. **لَعْنَهُ** *ore aperto* : palam, ingenua.

Ethpe. **لَعْنَهُ** *pass.* *et refl.* patuit ; *grammat.*, *ut Ethpa.* *Pa.* **لَعْنَهُ** *aperuit* ; *trop.* ex-
posuit, dilucidavit.

Ethpa. **لَعْنَهُ** *pass.* ; oculos apertos habuit *cæcus* ; *gramm.*, *vocali* (*✓*) instructa fuit *littera*.

Aph. **لَعْنَهُ** *aperire fecit* ; *cæcis* visum restituit, *c. acc. pers.* *Part.* **لَعْنَهُ** ; *subst.* **لَعْنَهُ** *apertio oculi* : ictus oculi, temporis momentum. **لَعْنَهُ** *قَهْمَتَا* eloquentia. **لَعْنَهُ** *قَهْمَتَا* uno oris frag-
mento (*gall.* en une bouchée). **لَعْنَهُ** *قَهْمَتَا* apertio, expugna-
tio ; apertura, *inde porta* ; prima pagina *libri*, præfatio, *ar.* الْأَنْتَخَةَ ; *vocalis* (*✓ seu
⋮*) ; *trop.* institutio. **لَعْنَهُ** *قَهْمَتَا* *ut لَعْنَهُ*. **لَعْنَهُ** apertura.

فَعَلَتْ duo fulcra telæ.
 فَعَلَهُ aperiens; *trop.*, rem pri-
 mo faciens; qui vocali (۷)
litteram movet; it. *stercus*
bubalorum; *pl. f.* فَعَلَاتْ
 vocalem (۷) sibi yindican-
 tes, *scil. litteræ gutturales*.
 فَعَلَهُ dim., *epistola parva*.

أَبْرَقَةً apertura.
 أَفْدَلَّا مُفْدَلَّا apertio; sanatio
cæcorum; trop. elucidatio.
 أَفْدَلَّا مُفْدَلَّا aperiens.
 أَنْفَدَلَّا qui aperiri potest,
 qui explanari potest.
 أَنْفَدَلَّا مُفْدَلَّا apertio.
 مُفْدَلَّا فِي الْفِتْسِيزْ، phtisis mor-
 bus.
 مُفْدَلَّا فِي الْفِتْسِيزْ، phtisicus.

مَلِكٌ, chald. **ରାଜୁ**, fut.
مَلِكٌ, miscuit, variegavit.
Part. pass. **مَلِكٌ**, va-
rius, versicolor. **مَلِكٌ وَمَلِكٌ**
horti variis ornati floribus.
Pa. **مَلِكٌ** variavit, varie orna-
vit. Part. pass. **مَلِكٌ دُو**, مَلِكٌ دُو,
f. **مَلِكٌ دُو**; varius, multiplex,
multiformis.

Ethpa. ፩፻፭፻ pass.
፩፻፭ vestis polymita ; ars va-
riegandi et ornandi.
፩፻፭ vestis polymita ; *in pl.*
gemmæ versicolores.

فَمَحْمَدًا, pl. فَمَحَّاتٍ diversitas;
colorum varietas; فَمَحْمَدًا
شَهَةً مُخْـ perplexitas.

فَمَا diversitas.

acupictor.

مُوَدَّعٌ varie.

Léños varietas.

Línea acupictor.

Power adapter

فَدْنَةٌ , pers. pl. بَيْنَكُورْ , فَدْنَةٌ ,
 imago, idolum ; f. فَدْنَةٌ ,
 pl. فَدْنَةٌ idolum mulibre.
 حَنْتَ فَدْنَةٌ idololatræ. حَمْلَةٌ
 فَدْنَةٌ templum idolorum.
 بَعْدَنَةٌ et بَعْدَنَةٌ وَفَدْنَةٌ
 فَدْنَةٌ idololatria.
 فَدْنَةٌ dim., idolum parvum.
 فَدْنَةٌ idololatria.
 فَدْنَةٌ ad idola pertinens.

וְלַכֵּד, *heb.* **לִכְדָּה**, *ar.* **لَكِدَّ**,
fut. **וְלִכְדָּה** *torsit, detorsit;*
trop. *pervertit; contudit, læ-*
sit. Part. pass. **לִכְדָּה**, **לִכְדָּה**;
adject. *obliquus, perversus;*
subst. v. infra. **וְלִכְדָּה** *وְلִכְדָּה*
distortis labiis præeditus: as-
tutus.

Ethpe. *ஆலி* pass.

Pa. ﴿تَسْرِيْت﴾ torsit, distorsit; *trop.* depravavit. *Part. pass.* ﴿مُتَسْرِيْط﴾, *f. emph.* ﴿مُتَسْرِيْط﴾ distor-
tus; *trop.* perversus, pravus;

فَدْكَمٌ مُعْتَدِلٌ مُعْتَدِلٌ fides recta.
Ethpa. **لَهْلَلِ** pass., corrugatus est; trop. dolo usus est.
لَهْلَلِ ei لَهْلَلِ torsio, tortuositas.
لَهْلَلِ distorte.

فَدْكَمٌ tortuositas, obliquitas.
فَدْكَمٌ, ar. فَتِيَّة , ellychnium.
فَدْكَمٌ dim., filum parvum; pl. **لَهْلَلِ** fimbriæ.
لَهْلَلِ obliquitas, tortuositas; trop. pravitas; it. in pl. tortura.
لَهْلَلِ oblique; perverse.
لَهْلَلِ et لَهْلَلِ obliquitas, pravitas.

لَهْلَلِ, ar. فَشَّة , rebellio; tumultus.
لَهْلَلِ, heb. لَهْلَلِ, aspis.

لَهْلَلِ, ar. فَتَقَنْ , fut. مُفَدَّدٌ rupit, spec. apostema; fudit; dissuit; *intrans.*, disruptus est.
Ethpe. مُفَدَّلِ ruptus est.
لَهْلَلِ eruptio; ruptura vomicæ, apostematis, hernia.
لَهْلَلِ, ar. بَطَاقَة , παττάχιον , epistola, chirographum, libellus; cfr. فَهْلَلِ; it. tabella nomina referens.

فَدْكَمٌ πανδοχεῖον , ar. فَندَق , diversorium, xenodochium; apotheca; capona; cfr. قَدْوَمٌ s. rad. فَرِ .
لَهْلَلِ caupo; stabularius.

فَدْكَمٌ فَدْكَمٌ mensa; cfr. assyr. passuru, heb. פְתַר explicuit et قَطَر cibum sumpsit; it. donum; liturgice, mensa sancta, mensa eucharistica; فَدْكَمٌ فَدْكَمٌ conviva. حَدْكَمٌ limen.

لَهْلَلِ, ar. فَتَ , fut. لَهْلَلِ minutatim confregit, in mecas friavit. Part. act. لَهْلَلِ , لَهْلَلِ . Part. pass. لَهْلَلِ , لَهْلَلِ . Ethpa. لَهْلَلِ pass.

Palpel لَهْلَلِ comminuit, neear. id.; trop. فَفَدَ حَمْفَةً labii proscidit: calumniatus est.

Ethpalp. لَهْلَلِ pass.
لَهْلَلِ f., it. لَهْلَلِ , heb. פְתַת , ar. فَتَات , pl. فَتَمْ فَدَهْلَلِ frustum panis, mica; fragmentum; it. Ephod, minus recte pro فَبِرِ .
لَهْلَلِ et لَهْلَلِ مُفَدَّدٌ comminutio, mica; trop. calumnia.

ج

ج seu لِيْلَه littera decima octava alphabeti; it. لِيْلَه forma abbrev. est vocis وَسْتَه exemplar, codex; حَقْ in alio codice.

1º Valet numerice: لِيْلَه = 90; لِيْلَه = 900; لِيْلَه nonagesimus.

2º Est littera sibilans emphatica; respondet heb. ح, ar. ح: لِيْلَه, heb. حَدَّ, ar. حَادَ, venatus est; لِيْلَه, حَادَ صَامَ, jejunavit; it. æquivalet ar. ح: لِيْلَه ligavit vulnus, heb. حَدَّ, ar. حَمَدَ.

3º Permutant inter se لِيْلَه et حَفْرَه et فَحْرَه sors; it. لِيْلَه et حَفْرَه et فَحْرَه vertigo capitis.

4º Pronuntiatur لِيْلَه ap. Nestor. sicut si sequatur ح vel ح durum: تُرْخَه voluit, fit in pronunt. تُرْخَه.

لِيْلَه, fut. لِيْلَه (slectitur ut لِيْلَه) sorduit, immundus fuit. Part. præs. لِيْلَه, لِيْلَه sorbens. Part. præt. لِيْلَه, pl. لِيْلَه.

Pa. لِيْلَه; it لِيْلَه et لِيْلَه, fut. لِيْلَه contaminavit. Part. act. et pass. لِيْلَه, pl. مَوَامِه, f. مَوَامِل.

Ethpa. لِيْلَه, لِيْلَه, لِيْلَه et لِيْلَه pass.

لِيْلَه c., heb. حَنَّ, pl. لِيْلَه et لِيْلَه sordes, faetor.

لِيْلَه, heb. حَنَّ, f. emph. حَمَدَه, pl. لِيْلَه, لِيْلَه, f. لِيْلَه sordidus, immundus.

لِيْلَه et لِيْلَه, it. حَامِلَه, pl. لِيْلَه et لِيْلَه sordes, impuritas.

لِيْلَه immundities.

لِيْلَه, ar. حَصْنَه, tamarindus.

رَحَه, chald. حَنَّ, ar. حَبَّ, fut. رَحَه voluit; expetivit; sibi complacuit, c. ح rei aut pers.; si al. verbum sequatur, ponitur in infinito: لِيْلَه رَحَه حَمَلَكَه discere voluit, vel in futuro: رَحَه ostendere voluit; nnq. etiam cum præt. رَحَه مَهْرَه مَهْرَه أَحَدَه Deo placuit ut ejus parentes morerentur; لِيْلَه رَحَه.

noluit ; *it. ut* لُوْجُ , aruit, exsiccatus est. *Part. act.* رِحْدَأْ , *f. pl.* رِحْدَيْ ; *f. f.* رِحْدَتْ ; بِلْ لَمْ رِحْدَأْ invitus; مَهْلَكَةً رِحْدَأْ vellem. لَمْ رِحْدَأْ si vis, si tibi placet. لَمْ رِحْدَأْ أَمْهَدْ quotiescumque tibi placuerit. أَمْبَعْ رِحْدَأْ وَسَأْ quasi videre vellent.

Ethpe. أَرْجَحْ delectatus est, sibi complacuit, *c.* حَ ; inclinatus fuit ad, *c.* حَكَ ; consensit, *c.* حَكَ ; probavit. *Part. präs.* مُنْرَجِحَأْ , مُنْرَجِحَأْ ; gratus. رِحْدَأْ , رِحْدَتْ voluntas, beneplacitum ; impulsus ; gramm., sensus *vocis* ; حَ كَهْ illi obsecutus est. حَ كَهْ رِحْدَأْ consentiens, fautor. وَدَحْمَهَلَأْ وَرِحْدَأْ contra voluntatem *alicujus* ; *c.* حَ , voluntas *in aliquem* ; *it. c.* حَمَأْ دُوْحَدَأْ كَهْ حَمَأْ : كَهْ وَبَعْ دُوْحَدَأْ كَهْ حَمَأْ optima voluntate erga omnes utaris ; *adverb.* حَدَّتْ vel حَدَّتْ تَعْمِيَهْ ultro, libenter. حَدَّتْ زُحْمَتْ تَعْمِيَهْ id.

زُحْمَتْ رِحْدَتْ sponte, ultro. رِحْدَتْ voluntarius ; arbitra- . riis ; *in pl. f.* رِحْدَتْكَأْ ; subst. dona voluntaria.

رِحْدَتْ voluntas. رِحْدَأْ , st. cst. رِحْدَهْ et لَمَأْ , pl. رِحْدَأْ رِحْدَأْ desiderium, pro-

positum ; *per ext.*, res quælibet, negotium, commodum ; aliquid, id quod ; *it.* opes, bona, suppellex. وَهْ لَكْ omnis res. حَ خَرْخَهْ وَهْ in qualibet re ; aliquatenus. لَكْ لَكْ لَكْ parum intercerat. لَكْ لَكْ لَكْ hujuscemodi res. أَمْبَعْ مَهْ سَأْ لَكْ sicuti nobis res videatur. وَهْ مَهْ مَهْ sulphur ; *adverb.* مَهْ وَهْ تَعْمِيَهْ a seipso ; sponte. لَكْ لَكْ لَكْ propter.

مُنْرَجِحَتْ acquiescens, contentus. مُنْرَجِحَتْ bona voluntas ; beneplacitum.

لَكْ لَكْ et لَكْ لَكْ heb. צָבָאָה , ordo, exercitus ; مَهْ مَهْ مَهْ Dominus Sabaoth seu Dominus exercituum.

وَهْ مَهْ مَهْ ad Dominum Sabaoth pertinens.

رِحْدَهْ , heb. حَبَّ , ar. صَبَغْ , fut. تِنْخَهْ tinxit, intinxit ; immersit ; baptizavit.

Ethpe. أَرْجَحْ pass. ; baptizatus est, ar. إِصْطَبَنَهْ .

Pa. رِحْدَهْ madefecit ; tinxit ; رِحْدَهْ رِحْدَهْ panem intinxit.

Ethpa. أَرْجَحْ pass. ; immersus est.

رِحْدَأْ et رِحْدَأْ رِحْدَأْ tintura ; vestis tincta.

جِدْ *id.*; medicamentum exter-
num.

جِدْتَهُ *ut جِدْتَهُ*; *it.* vestis
tincta.

جِدْتَهُمَا *tinctus, tinctura.*

جِدْتَهُ, *ar.* صَبَاغٌ, *tinctor.*

جِدْتَهُمَا *tinctura, ars tinctoris.*

جِدْتَهُ *f., ar.* اِضْبَاعٌ, *pl.* pauci-
tatis (*i. e.* *infra decem*), **جِدْتَهُ** ;

it. emph. **جِدْتَهُ**, *pl.* multitud.

جِدْتَهُ *et جِدْتَهُ* *جِدْتَهُ* *digitus; index.*

جِدْتَهُ *sibi digitos*
momordit: *eum pœnituit.* **جِدْتَهُ**

جِدْتَهُ *digitale* (*gall. dé à cou-*

dre). **جِدْتَهُ** وَأَوْمَمَهُ *et جِدْتَهُ* *جِدْتَهُ* *ornatus.*

έρμωδάντυλος, *colchicum au-*

tumnale. **جِدْتَهُ** وَدَهَةَكَهُ *digitus virginum h. e. species*

uvarum longioris formæ.

جِدْتَهُ *ad digitum pertinens.*

جِدْتَهُ ablutio baptismatis, baptismus.

جِدْ, *fut.* تُوْجِدْهُ *garrivit,*
deliravit, desipuit. *Part.*
præs. جِدْ, **جِدْ**; *stultus.*

جِدْتَهُ *garrulitas, ineptiæ, deli-*
rimentum.

جِدْهُ, *it.* جِدْهُ *delirans.*

جِدْهُ stupiditas.

جِدْهُ *et جِدْهُ*, *ar.* صِيرٌ, myrrha;
aloë.

جِدْهُ ineptus.

جِدْ *c., st. c.* جِدْ, *pl.*

جِدْتَهُ, *ornatus, ornamentum.*

جِدْ *verb, denom.*, ornavit,
exornavit. *Part. pass.* مَوْجَدْهُ,
f. emph. مَوْجَدْهُ, *ornatus.* أَنْجَفَ مَوْجَدْهُ navis
ornata. *trop.* Virgo Maria.

Ethpa. جِدْ *pass. et refl.*

جِدْ *exornatio; fucus.* جِدْ مَعْتَدِلًا elegantia sermo-
nis.

جِدْ *adornatio.*

جِدْ *ornator.*

جِدْ *et جِدْ* مَوْجَدْهُ *ornatus.*
جِدْ, *ar.* مَسْطَبَةٌ, *sugges-*

tum. جِدْ مَوْجَدْهُ *exornatio.*

جِدْ *c., pl.* جِدْ *ornatus;*
vestes ornatæ; opus aurifi-
cis; materiæ prostiosæ,
uti annuli, tapetes, tela etc. ;
it. fulcrum; cella.

جِدْ *et جِدْ*, *fut.* تُوْجِدْهُ *vasta-*

tus, desolatus est; desertus,
sterilis fuit; rubigine erosus

est; c. جِدْ, *orbatus est; it.*

irrisit, illusit, c. جِدْ. *Part.*

præs. et act. جِدْ, *derelic-*

tus; subst. littera جِدْ; *f.*

emph., جِدْ, *pl. f.* جِدْ, *emph. et subst.* جِدْ loca

- deserta; *it. adj.* vacuus. *Part.* *præt.* et *pass.* لِبْرَةٌ، زَجْرَةٌ، *f.*
emph. لَبْرَةٌ.
Ethpe. لَبْرَةٌ desertus est;
illusit, *c. s.*
- Pa.* لَبْرَةٌ vastavit; jocatus
est, lascivivit; illusit.
- Ethpa.* لَبْرَةٌ *ut Ethpe.*
- Aph.* لَبْرَةٌ desertum reliquit.
لَبْرَةٌ, *pl.* لَبْرَةٌ vastatio, deser-
tum, desolatio.
- لَبْرَةٌ *id.*; *it.* intuitus, *cfr.* لَبْرَةٌ.
لَبْرَةٌ per irrationem, ironice.
لَبْرَةٌ illusio, deceptio; lusus,
jocus.
- لَبْرَةٌ desolatio, solitudo.
- لَبْرَةٌ derisio.
- مُنْبَثِثٌ deceptor, fallax; de-
risor, scurra.
- مُنْبَثِثٌ deceptio, hypocri-
sis.
- مُنْبَثِثٌ derisor; sterilis.
- مُنْبَثِثٌ fraus; sterilitas.
- لَبْرَةٌ, *fut.* لَبْرَةٌ *et* لَبْرَةٌ defixe in-
tuitus est, contemplatus est,
c. s.; *nnq.* maligne aspergit.
- Ethpa.* لَبْرَةٌ intuitus est,
c. s.
- Aph.* لَبْرَةٌ intente defixit oculos; *c. s.*, *ut Pe.*; *it.* attendit.
- لَبْرَةٌ intentio.
- لَبْرَةٌ defixe intuens, *c. s.*
- لَبْرَةٌ stibium, fucus; hyacin-
thus, carbunculus.
- مُنْبَثِثٌ intuitus, aspectus.
- لَبْرَةٌ, *pl.* لَبْرَةٌ tempus, pars
capitis, *ar.* صَدْغَةٌ; *it.* cincinni;
setæ animalium.
- لَبْرَةٌ, *fut.* لَبْرَةٌ ebrium reddi-
dit; *cfr. ar.* سَدَرٌ, vertigine
captus est.
- Ethpe.* لَبْرَةٌ pavidus fuit,
cfr. مَهْمَةٌ.
- Pa.* لَبْرَةٌ vino indulxit; caupo
fuit. *Part.* مُنْبَثِثٌ; *adj.*, ebrius.
- Ethpa.* لَبْرَةٌ soporatus est
vino.
- Aph.* لَبْرَةٌ ebrium reddidit;
vertigine afficit.
- لَبْرَةٌ vertigo, *ar.* سَدَرٌ; velamen
capitis, *cfr.* مَهْمَةٌ; *it.* pectus,
ar. صَدَرٌ.
- لَبْرَةٌ vel لَبْرَةٌ cephalalgia.
- لَبْرَةٌ vertigo capitis; crapu-
la; stultitia.
- مُنْبَثِثٌ föede.
- لَبْرَةٌ stupiditas.
- لَبْرَةٌ *et* لَبْرَةٌ, *fut.* لَبْرَةٌ sitivit;
trop. desideravit; مُنْبَثِثٌ
sitivi et dedistis
mihi bibere. *Part.* præs.
- لَبْرَةٌ, لَبْرَةٌ; *Part. præt.* لَبْرَةٌ,
لَبْرَةٌ, *pl.* لَبْرَةٌ *emph.* لَبْرَةٌ,

f. emph. ۱۶۰۷، *pl.* ۲۰۷،
emph. ۱۶۰۷؛ *adject.* siccus;
absol. ۱۰۷ terra arida; *cfr.*
heb. חָרֵץ.

Pa. ۱۰۷ vehementer sitivit.

Ethpa. ۱۰۷ sitivit.

Aph. ۱۰۷ sitire fecit; *trop.*
 desiderium excitavit.

۱۰۷، ۱۰۷ et ۱۰۷ sitis; *c.*
aff. ۱۰۷.

۱۰۷ *id.*

۱۰۷ siccitas; tempus si-
 tis; *it. adj.* sitibundus. ۱۰۷
 ۱۰۷ vel ۱۰۷ جُلَانِی loca ari-
 da et inaquosa.

۱۰۷ avide.

۱۰۷ sitis.

۱۰۷ مُوْتَهَّدُونْ siti afficiens.

۱۰۷ مُوْتَهَّدُونْ sitis.

۱۰۷، *al.* ۱۰۷، *heb.* חָרֵץ،
ar. صَلَّى، *fut.* ۱۰۷ hinnivit;
trop. stulte exultavit im-
 pius; libidine exarsit.

۱۰۷ et ۱۰۷ hinnitus.

۱۰۷ hinniens; *trop.* libidino-
 sus.

۱۰۷ hinnitus.

۱۰۷، ۱۰۷ cicuta herba (gall.
 ciguë).

۱۰۷، *pers.-ar.* صَهْرَيَّة،
 cisterna, alveus aquarum.

۱۰۷ fut. ۱۰۷ aruit, languit;
cfr. ar. صَوَى aruit et
 emaciatus est; *it. ut Aph.* coa-
 cervavit; erexit; obturavit.
Part. præs. ۱۰۷, *ar.* صَوَى
 aridus. *Part. præt.* ۱۰۷, ۱۰۷
id.

Ethpe. ۱۰۷ conflixit.

Pa. ۱۰۷ exsiccavit, marces-
 cere fecit; *it., ar.* صَأَى, garri-
 vit, pipivit avis.

Aph. ۱۰۷ coacervavit.

Palpi ۱۰۷, *ar.* كَائِنَاتٍ, *fut.*
 ۱۰۷, pipivit avis, garrivit;
 striduit.

۱۰۷ cippus; siccitas, *cfr.* heb.
 צִיר, צִיר et צִיר id.

۱۰۷ aridus; *it. ut seq.*

۱۰۷ pro مُوْتَهَّدُونْ pipitus;
 مُوْتَهَّدُونْ pipitus avium.

۱۰۷ مُوْتَهَّدُونْ pipire faciens aves.

۱۰۷, *fut.* مُوْتَهَّدُونْ venit, adve-
 nit; convenit, frequentavit,
 adiit, *c.* ۱۰۷ vel بُنْجٌ. *Part.*
præs. مُوْتَهَّدُونْ بُنْجٌ; مُوْتَهَّدُونْ بُنْجٌ
 quum nos conveneritis.

Pa. ۱۰۷ venire, convenire
 fecit, accersivit: congrega-
 vit; *trop.* animo collegit; *it.*
 attulit, adduxit, paravit; ef-
 fecit, causa fuit.

Ethpa. أَرْجَحَ convenit; inventus est.

أَرْجَحَ adventus, conventus, receptaculum. حَدَّدَ locus ubi convenitur; scopus, terminus. حَدَّدَ, pl. حَدَّدَهُ, consocius.

أَرْجَحَ qui advenit.

أَرْجَحَ adventus; effectio, præparatio.

أَرْجَحَ, pl. أَرْجَحَاتٌ fragmentum ligni; caro salita, succidia; cfr. *talm.* حَدَّدَ.

أَرْجَحَتْهَا arecessens, advenire faciens; parans.

أَرْجَحَتْهَا adventus; præparatio.

أَرْجَحَتْهَا frequentator.

أَرْجَحَتْهَا propensio.

أَرْجَحَتْهَا arundo, fistula.

أَرْجَحَتْهَا laminosus. رُوفَةً لَّجْمَانًا alumen (*gall.* alun).

أَرْجَحَتْهَا, heb. צָדֵד, ar. صَادَ, fut. يَرْجِحُ venatus est, piscatus est; per extens., cepit, deprehendit, occupavit; trop. pertraxit ad, c. حَدَّدَ insidiatus est. Part. act. يَرْجِحُ, . Part. pass. يَرْجِبُ, يَرْجِبَ.

Ethpe. مَوْلَانًا pass.

Pa. مَوْلَانًا venatus est, insidiatus est. Part. pass. مَوْلَانًا, مَوْلَانًا;

f. emph. et adj. مَوْلَانًا venatica avis.

Aph. يَرْجِبُ piscari fecit; trop. scrutatus est. Part. pass. مَوْلَانًا; venatu captus.

أَرْجَحَتْهَا, st. abs. et st. cst. يَرْجِبُ, ar. صَيْدٌ, venatio, piscatio, præda; cibus, illicium; it. per extens., laqueus, rete.

أَرْجَحَتْهَا piscatio.

أَرْجَحَتْهَا venatorius; it. aromatarius, pharmacopola, deriv. a يَرْجِبُ urbe Sidone, cfr. ar. كَيْنَالَانِيَّ.

أَرْجَحَتْهَا viaticum, cf. يَرْجِي et ar. زَرَادَة; it. ut يَرْجِي loquela.

أَرْجَحَتْهَا venatio, piscatio.

أَرْجَحَتْهَا et مَوْلَانًا venator, pisca-

tor.

أَرْجَحَتْهَا more venatorum seu piscatorum.

أَرْجَحَتْهَا, ar. مَصْيَدَة, pl. مَوْلَانًا c. suff. حَدَّدَتْهَا, rete, laqueus; cancelli.

أَرْجَحَتْهَا reticulatus.

أَرْجَحَتْهَا prehensibilis; trop. intelligibilis.

أَرْجَحَتْهَا apprehensio.

أَرْجَحَتْهَا, it. يَرْجِبُ, cum suff. يَرْجِبُ, vel يَرْجِبُ, يَرْجِبَ, يَرْجِبَ, يَرْجِبَ, يَرْجِبَ, etc., particula possessionem et rei

proximitatem indicans, fere id. q. حَمْلًا , apud, penes ; *cfr. heb.* حَنْد et ar. حَنْد latus ; حَنْدَه تُكَبِّرُ totus ejus animus apud eum est ; *nnq. c. motu, ad ; trop. erga ;* حَمْلَه وَمِنْهُ amor tuus erga me ; *c. مُّنْهُ , a, ab, ex ;* حَمْلَه مُّنْهُ ex parte regis. حَنْدَه تُكَبِّرُ quatenus homo est. حَنْدَه وَمُّنْهُ زَوْجُه quod ad te attinet. حَنْدَه مُّكَلَّا parum, fere.

صَاحِبٌ حَنْدَه , heb. صَاحِبَه , ar. صَاحِبَه , fut. تُصَوِّبَه clamavit ; tumore in palpebris laboravit *oculus*. *Pa.* صَاحِبَه claram vocem extulit. *Aph.* صَاحِبَه clara voce locutus est.

صَاحِبَه حَنْدَه clamor, ululatus, dolor ; *it.* mixtura ceræ et plumbi malleo facile cedens.

صَاحِبَه حَنْدَه sonus acutus, ar. صَيَاه clamor.

صَاحِبَه حَنْدَه clamor, ululatus ; fragor ; حَنْدَه حَنْدَه tonitru.

صَاحِبَه حَنْدَه et حَنْدَه dolor ex tactu ulcerum.

صَاحِبَه حَنْدَه tædium.

صَاحِبَه حَنْدَه , v. حَنْدَه .

صَاحِبَه حَنْدَه , ar. حَنْدَه , sceptrum.

صَام , heb. حَنَدَ , ar. صَام , fut. حَنَدَه , jejunavit ; trop. abstinuit, c. مُّنْهُ .

Ethpe. حَنْدَه لِلْيَوْمِ jejunio celebratus est dies.

Aph. حَنْدَه jejunium indixit.

صَفَرَه حَنْدَه , st. absol. et cst. حَنْدَه , pl. حَنْدَه , ar. صَفَرَه , jejunium ; حَنْدَه وَمُّهَنْدَه حَنْدَه jejunium usque ad vesperam. حَنْدَه وَمُّهَنْدَه حَنْدَه jejunium quadragesimale. حَنْدَه وَمُّهَنْدَه id. حَنْدَه وَمُّهَنْدَه حَنْدَه وَمُّهَنْدَه حَنْدَه وَمُّهَنْدَه jejunium Nativitatis Domini. حَنْدَه وَمُّهَنْدَه حَنْدَه وَمُّهَنْدَه jejunium Deiparæ Virginis. حَنْدَه وَمُّهَنْدَه حَنْدَه وَمُّهَنْدَه jejunium Moslemorum (ar. رَمَضَان). حَنْدَه وَمُّهَنْدَه toto jejunii tempore. حَنْدَه وَمُّهَنْدَه ad jejunium pertinens. حَنْدَه وَمُّهَنْدَه id. ; cum jejunio conjunctus. حَنْدَه وَمُّهَنْدَه jejunus.

صَافَرَه حَنْدَه et حَنْدَه حَنْدَه jejunus : abstemius.

صَافَرَه حَنْدَه et حَنْدَه sitiens.

صَافَرَه حَنْدَه et deriv. v. s. حَنْدَه .

صَافَرَه حَنْدَه , pl. حَنْدَه حَنْدَه fimbria, phylacteria : cincinni ; inde trop. sarmenta inflexa ; flammæ instar cincinnorum tortæ ; *it.* flos cannæ.

ڙوڙمٰ et **ڙوڙمٰ** adj. a præc.
caudam habens; inde subst.
cometa.

ڙوڙمٰ turtur, v. s. **ڙوڙ**.

ڙوڙ, heb. צָרָר, ar. صَارَ, يَصْرُورُ, fut.
ڙوڙمٰ, figuravit, finxit, pinxit,
depinxit, delineavit; **ڙوڙمٰ** signavit. **ڙوڙمٰ** formavit
signum crucis; trop. figurative
designavit, symbolice expressit;
ڙوڙمٰ præfiguravit;
it. caligine oculos perstrictos
habuit, ar. ضَرَّرَ cæcus fuit.
Part. act. **ڙوڙمٰ**; subst. ca-
lamus scriptorius, graphium plumbeum, penicil-
lus. Part. pass. **ڙوڙمٰ**;
ڙوڙمٰ picta cervice: pa-
lumbes torquata. **ڙوڙمٰ** Sirius
الشغرى (ar. constellatio),
ut **ڙوڙمٰ**. **ڙوڙمٰ**

Ethpe. **ڙوڙمٰ** et **ڙوڙمٰ** pass.
ڙوڙمٰ مَهْمَلٌ præsignatus,
præfiguratus.

Pā. **ڙوڙمٰ** et **ڙوڙمٰ** pinxit. Part.
pass. **ڙوڙمٰ**, مَهْمَلٌ, f. emph.
ڙوڙمٰ مَهْمَلٌ; **ڙوڙمٰ** avis
picta: pavo; it. nitide orna-
tus, coloribus illustratus.

Ethpa. **ڙوڙمٰ** pass.

ڙوڙ imp. verbor. **ڙوڙ** et **ڙوڙ**.

ڙوڙمٰ, st. c. **ڙوڙمٰ**, pl. **ڙوڙمٰ**, heb.

ڙوڙ, ar. صُورَةٌ, c. suff.
ڙوڙمٰ, figura, forma, imago,
pictura; scriptura; trop.
repræsentatio symbolica, typus.
ڙوڙمٰ forma
scripturæ; textus. **ڙوڙمٰ** textus
libri; exemplum Biblio-
rum, inde antonomastice
etiam sine **ڙوڙمٰ**, Scriptura
Sacra, seu Vetus et Novum
Testamentum. **ڙوڙمٰ** vel
absol. **ڙوڙمٰ** delineamenta
vultus; per extens., indoles;
adject. c. præf. **ڙوڙمٰ** pictus;
ڙوڙمٰ canis pictus, seu
Sirius *constellatio*; **ڙوڙمٰ** evan-
gelium pictum i.e. coloribus
ornatum (gall. enluminé).

ڙوڙمٰ, heb. צוואר, ar. cer-
vix, collum; it. gibbus came-
li; cfr. ar. صَرَّا inclinavit;
trop. transitus erecto collo: cum superba
insolentia. **ڙوڙمٰ** collo a-
perito: cum fiducia. **ڙوڙمٰ**
collum durum: contumacia.
ڙوڙمٰ servitus. **ڙوڙمٰ** حَجْبَسًا
indusii pars ambiens collum;
ipsum indusium. **ڙوڙمٰ** summa
pars malorum puni-
corum.

ڙوڙمٰ ut usitat. seq.

لُجْ	auditor.
لُجْ وَقْتْ	auditio, auscultatio.
لُجْ وَقْتْ et لُجْ وَقْتْ vertigo, caligatio oculorum; stupor. خفه	
لُجْ وَقْتْ وَقْتْ اسْبَابْ deficiente animo vertiginem passa est.	
لُجْ idolum pictum; graphium.	
لُجْ plasmator, fector	
لُجْ rubedo oculi ex ictu orta; vertigo.	
لُجْ ، لُجْ ، pl. لُجْ ، f. لُجْ ، formator, pictor; acupictor; cælator.	
لُجْ ars picturæ; cælatura.	
لُجْ et communius لُجْ ، pl. لُجْ et لُجْ ، heb. כָּרְדֹּו, cardo januae.	
لُجْ exornatio.	
لُجْ pictor.	
لُجْ وَقْتْ اسْبَابْ formatio; imaginatio.	
لُجْ ، fut. لُجْ audivit, auscultavit; attendit. Part. act. لُجْ . Part. pass. لُجْ ، f. emph. لُجْ ; cfr. Pa. v. لُجْ et ar. لُجْ id. لُجْ oratio exaudita.	
Ethpe. لُجْ لُجْ pass.	
Aph. لُجْ auscultavit, exaudiuit; cfr. لُجْ ، s. v. لُجْ .	
لُجْ auditio; auditus; fama; sonus, vox, cfr. ar. صوت id.; trop. colloquium, consuetudo, societas.	
لُجْ ، fut. لُجْ ut usit. seq.	
Pa. لُجْ conviciis affecit, vituperavit, maledixit.	
Ethpa. لُجْ pass.	
لُجْ ، emph. لُجْ ، pl. لُجْ وَقْتْ ، لُجْ وَقْتْ convicium, injuria, maledictio. مكلا	
لُجْ وَقْتْ probrosus sermo.	
لُجْ وَقْتْ tædium, angustiae mentis.	
لُجْ وَقْتْ مُوسِيَةً convitiator, maledicus, f. مُوسِيَةً .	
لُجْ وَقْتْ ut لُجْ سُنْنَةً .	
لُجْ وَقْتْ مُوسِيَةً conviciis affectus.	
لُجْ ، heb. حَنْوَ ، ar. صخور ، splendor, cœlum serenum; cfr. سُفَّا .	
لُجْ .	
لُجْ ، heb. حَنْوَ ، fut. نُجْ وَقْتْ splenduit sol, incaluit, arsit; cfr. لُجْ ، s. لُجْ ، et ar. حَنْوَ et ضَحْيَ .	
Aph. لُجْ declaravit, manifestavit, pronuntiavit; evulgavit, edidit librum; scripsit, exscripsit, dictavit librum.	
Ettaph. لُجْ لُجْ pass.	
لُجْ وَقْتْ c., ar. صحاح , exemplar libri integrum; pars libri, capitulum; trac-	

tatus; ح pro قوستا juxta codices; it. in alio codice.

أ وسْتَمْعَهُ Versio simplex, Peschito. وسْتَمْحَنَتْا Versio Septuagintaviralis.

أ وسْتَمَلْهُ exemplar, chirographum, instrumentum.

أ وسْتَمَلْهُ exemplar, codex, pl. أ وسْتَمَلْهُ.

أ وسْتَمَلْهُ splendens, lucidus; ca- lidus.

أ وسْتَمَلْهُ splendor.

أ حَدْهُ و مَوْسِنَهُ expressio. مَوْسِنَهُ cum designatione no-

minum.

أ وسْتَمَلْهُ , f. emph. وسْتَمَلْهُ et وسْتَمَلْهُ , pl. وسْتَمَلْهُ sordidus, immundus.

Pa. أ وسْتَمَلْهُ verb. denom., se contaminauit lascive agendo, libidine indulxit; maledixit.

Ethpa. أ وسْتَمَلْهُ se polluit.

أ وسْتَمَلْهُ , heb. מַמְצָא , impudicitia, sordes, impuritas, immunditia.

أ وسْتَمَلْهُ , ar. صَخْنَة et صَخْنَة , ferulum e pisciculis constans.

أ وسْتَمَلْهُ pudefactus, cfr. ar. صَجَرْهُ rufo colore prædictus est.

أ وسْتَمَلْهُ , al. مَوْسِنَهُ , rubus; rubicundus; it. rubor.

أ مَوْلَعَهُ suggestum, cfr. ar. مَوْلَعَهُ et مَنْطَبَة .

أ وسْتَمَلْهُ , v. s. مَوْسِنَهُ .

أ وسْتَمَلْهُ et وسْتَمَلْهُ , pers-ar. شِيطَرْجَه , lepidium planta.

أ وسْتَمَلْهُ , v. s. وسْتَمَلْهُ .

أ وسْتَمَلْهُ , vox ar. صَخْرَة , rupes, saxum templi Salomonis.

أ وسْتَمَلْهُ et وسْتَمَلْهُ , fut. سَوْلَهُ , se inclinavit, declinavit dies; tetenit res ad, vergit, respexit, c. وسْتَمَلْهُ ; trop. propensus fuit ad, favit, pronus fuit ad, c. حَدَهُ , لَهُ vel وسْتَمَلْهُ , vel c. وسْتَمَلْهُ , et futuro; transit., tetendit, inclinavit, intendit, protendit; declinare fecit, deflexit, pervertit; وسْتَمَلْهُ , nnq. abs. perverse egit. وسْتَمَلْهُ tetendit laqueos. وسْتَمَلْهُ aurem præbeas. وسْتَمَلْهُ animum intendit. وسْتَمَلْهُ , بَشَّهُ ad amorem rei propendit. Part. act. et præs. وسْتَمَلْهُ ; subst. in emph. وسْتَمَلْهُ tendicula. Part. pass. et præt. وسْتَمَلْهُ ; وسْتَمَلْهُ حَسْنَهُ وسْتَمَلْهُ ad albedinem inclinantes, subalbidi, candicantes.

Ethpe. اَرْهَكْ se inclinavit, declinavit; *trop.* propensus fuit, favit, *c.* حَدَّ, vel حَدَّ *vel* deflexit, discessit a *vero*, *bono* etc. *c.* مَهْنَجْ . اَرْهَكْ وَنَجْ . مَهْنَجْ se comparavit ad agendum.

Pa. رَكْ , ar. حَلَى , inclinare fecit, flexit, *inde* oravit, direxit preces ad, *c.* حَلَّ *nng.* *c.* حَدَّ ; precatus est pro, benedit, *c.* حَلَّ ; *inde* ad pacem admisit, redintegravit patriarcham, episcopum ; *it.* tenuit laqueos. بَلَّا حَلَّا ut se conferat ad orandum.

Ethpa. اَرْهَكْ *pass.*; *it.* commemoratus est in oratione; *intr.*, deflexit.

Aph. اَرْهَكْ tetendit, præbuit.

Ethpal. اَرْهَكْ *pass.* ut *Ethpa.*

Ethpaulal. اُرْهَكْمَكْ incurvatum habuit formam.

رَكْta inclinatio, declinatio; locus depressior; *trop.* propensio; qualitas; *ap. astron.*, declinatio stellæ; *ap. gramm.*, præfixio litterarum حَلَّ .

رَكْتَا declinatio, inclinatio.

رَكْمَأْ, st. est. رَكْه , *ap. Nestor.*

رَحْفَة , ar. حَلَّة , *vel* حَلَّة , *pl.* رَحْفَة , رَكْمَأْ oratio, preces; redintegratio cum Ecclesia,

admissio ad ejus communio nem. رَكْمَأْ وَأَحْمَرْ وَحَمَّتْ oratio dominica. رَكْمَأْ إِوْأَسْدَأْ oratio secreta. رَكْمَأْ وَهَمَّدْتَأْ oratio post cœnam.

رَكْمَأْتَأْ ad preces pertinens; cum precibus conjuncta res. مَلَّا حَمَّدْا وَكَمَّسْدَأْ peregrinatio sacra.

رَكْمَأْنَمَهْ precursorie. مُرَوْلَحْتَأْ aberrans; perversus; *c.* لَمْ , immotus, firmus.

مُرَوْلَحْتَأْ cum inclinatione; suo motu, sponte; *it.* perverse.

مُرَوْلَحْتَنَمَهْ inclinatio; declinatio, deflexio; *c.* لَمْ , aberratio, *inde* apostasia, deflexio; لَمْ مُرَوْلَحْتَنَمَهْ firmitas, constantia.

مُرَكْتَنَمَهْ orationi deditus; suppli cantium custos, *Jovis epitheton*; *apud astron.*, ad declinationem *cæli* pertinens; *apud gramm.*, signum interpunctionis deprecationem indieans.

مُرَكْتَنَمَهْ hæresis Messalianorum, vocati مُرَكْتَنَمَهْ et مُرَكْتَنَمَهْ orantes, quia credebant totum cultum esse in oratione.

رَكْسَأْ , ar. صَلَاتَة , lapis super quem odoramenta conteruntur.

رَكْتٌ, ar. رَكْتٌ, fut. رُوكْمَتُ, crucifixit. Part. pass. رَكْتٌ; emph. et subst. رَكْنَدًا crux; signum crucis; cfr. ar. صَلِيبٌ et pers. حَلِيْمًا; per extens., imago Christi crucifixi; crucifixio; it. ad usum scribarum nota; trop. tribulatio.

رَكْحٌ se crucis signo munivit. Ethpe. رَكْحٌ pass.

Aph. رَكْحٌ signum crucis formavit.

رَكْهَمًا crucifixio.

رَكْخَاتٌ in formam crucis.

رَكْمَةٌ crucifixor, inde Judæus; f. رَكْهَمًا, per extens., Synagoga.

رَكْهَمٌ dim., parva crux.

رَكْحَمٌ in formam crucis.

رَوْحَحَنَا glycyrrhiza radix (gall. réglisse).

رَحْدَهَمَا fistula parva arundinea, tibicen.

رَكْهَمَا ricinus.

رَكْحَمَا funis seu rudens navis.

رَحْمَهَمَا et رَحْمَهَمَا lignum vel ferrum instar ellychnii inflammatum, fax; sulphur.

رَكْبٌ, fut. رُوكْمَهُ fulsit rem.

رَجْبَانَا pl. رَجْبَانَا fulerum; cfr. σελίς, σελίδες tabulatum.

رَكْسٌ, heb. רָקֵס, fut. رُوكْسَمَتُ fudit, secuit; it. ar. رَكْسٌ, profecit, prosperum eventum consecutus est.

Pa. رَكْسٌ secuit, excidit.

Ethpa. أَرْكَسٌ disruptus est; it. prosperum eventum consecutus est.

Aph. رَكْسٌ prosperum reddidit, obsecundavit; intrans., prospere se habuit, floruit; prospere cessit res; it. illapsus est spiritus Dei, c. رَكْسٌ pers. Part. مَوْكَسًا, fortunatus, dives.

Ettaph. رَكْسَلًا prospere se habuit.

رَكْسَنَا fissio; fissura, inde furca pedis equini; in pl. رَكْشَنَا ligna excisa.

رَكْسَنَا et رَكْسَنَا, pl. scissio, scissura, inde plaga; hemiceranium.

رَكْسَنَا lignum fissum.

رَهْكَسَا scissio.

צְלַחִיה, ar. صَلَاجِيَّة, heb. رَهْكَسَةٌ, pl. رَهْكَسَاتٌ phiala, lagena. رَهْكَسَةٌ prospere.

رَهْكَسَةٌ dilaceratio; eventus felix.

رَهْكَسَةٌ scissor, effractor.

رَهْكَسَةٌ, pl. رَهْكَسَاتٌ felix

successus; status florens *rei*,
incrementum; victoria.

مُهَاجِرَةً وَحْسَنَا prosper.

﴿﴾, heb. ﴿﴾, ar. صَلَّ, يَصْلُّ, صَلَّ, fut. ﴿﴾ tinnivit; it. trans., ar. يَطْهُرُ, purificavit, removit, cfr. ﴿﴾. Part. pass. وَكَلْمًا, وَكَلْمًا; adject. lucidus, clarus, serenus, limpidus, translucidus; trop. purus, innocens; c. مُهَاجِرٌ, immunis.

Pa. وَكَلْمًا purgavit, liquavit, colavit, mundavit; abstulit.

Part. pass. مُهَاجِرًا, مُهَاجِرَةً; adj. f. emph. مُهَاجِرَةً id. q. وَكَلْمًا.

Ethpa. وَكَلْمًا pass.

Aph. وَكَلْمًا abstulit.

وَكَلْمًا tinnitus; puritas.

وَكَلْمًا tinnitus; puritas. وَكَلْمًا et وَكَلْمًا tericulum ad aves a satis fugandas.

وَكَلْمًا serenitas, aeris puritas; trop. animæ vel conscientiæ puritas.

﴿﴾, وَكَلْمًا purificatio; lucidas.

﴿﴾, وَكَلْمًا clarus; purus.

وَكَلْمًا puritas.

مُهَاجِرَةً pure.

مُهَاجِرَةً purificatio, puritas.

مُهَاجِرَةً purificator.

مُهَاجِرَةً f., ar. مَصَلَّةً pl. مَتَّلَّا colum; it. fæx vini.

مُهَاجِرَةً purificatio, exemption.

مُهَاجِرَةً corium, cfr. ar. مَهَاجِرَةً et talm. أَلْهَاجَةً id.

مُهَاجِرَةً, talm. צְוָתֵרֶלֶת et צְוָתֵרֶבֶת, turturis species, ar. حَنْاطُلْ, cfr. seq.

مُهَاجِرَةً et مُهَاجِرَةً; it. مُهَاجِرَةً, heb. צְוָתֵרֶבֶת, ab inus. وَكَلْمًا, cymbalum; cfr. ar. حَنْاطُلْ tinnivit.

مُهَاجِرَةً وَدَوْلَةً ardea, avis piscibus vivens.

وَكَلْمًا, وَكَلْمًا, heb. صَلَّ, ar. صَلَّ, simulacrum, effigies; imago, pictura; statua, idolum; repræsentatio, persona; f. وَكَلْمًا idolum muliebre; cfr. ar. زَكْرٌ species, et neoar. زَكْرٌ persona, homo; وَكَلْمًا, وَكَلْمًا آفَقَتْ idolum quadrifrons. وَكَلْمًا وَدَأْ ساگِيٰ Sagittarius, constellatio. وَكَلْمًا جَمِينٌ Gemini constellatio. خَلَامٌ وَكَلْمًا idolatria.

وَكَلْمَةً dimin., idolum parvum; it. arboris species, cfr. ar. خَلَامٌ.

Pa. وَكَلْمًا v. denom., figuravit, effigie expressit; finxit, formavit.

Ethpa. أَرْجَفَ pass.; figuram humanam accepit fetus; trop. conformatus est, aptus redditus est ad, c. حَمَّ.

Ethpalp. أَرْجَفَ مَكْحُونَةً adumbratus est, efformatus est.

أَرْجَفَ مَهْكُمَةً effigies, figura, icon; figuratio.

أَرْجَفَتْ رَجْمَنَةً repraesentatio, expressio effigiei.

أَرْجَفَتْ تَارَانْتَلَا tarantula aranea; it. pediculus aquilæ; pl. أَرْجَفَتْ وَرَجْمَنَةً vespæ.

أَرْجَفَتْ مُوْرَجْفَنَا fector, plasmator.

أَرْجَفَتْ مَهْرَجَنَا flos seu tremor lactis.

رَجْف, fut. أَرْجَفَ contudit, discidit; vulneravit; وَكْفَهْ حَمَّا; anceps, mente dubius.

Ethpe. أَرْجَفَ i pass.

Pa. أَرْجَفَ graviter contudit; vulneravit; dehiscere fecit; aperuit portam; seq. al. verbo, irrupit, conatus est.

Ethpa. أَرْجَفَ disruptus est, vulneratus est.

Aph. أَرْجَفَ dehiscere fecit portam; trop. prodire fecit, monstravit. *Part. pass.* مُوْرَجَفَهْ; *emph. et subst.* مُوْرَجَفَهْ apertio.

Ettaph. أَرْجَفَ لِي prodiit, appauuit.

أَرْجَفَهْ, f. emph. scissio, sectio; trop. dissidium; it. in st. abs. eruptio; fructus mali granati, ipsa flos mali granati. أَرْجَفَهْ بَأْفَهَهْ fissura januae. أَرْجَفَهْ بَهَهْ meatus corporis.

أَرْجَفَهْ وَهَجَفَهْ comminutio aromatum, conditura.

أَرْجَفَهْ وَهَجَفَهْ et أَرْجَفَهْ pl. مَهْرَجَفَهْ contusio; vulnus.

أَرْجَفَهْ scissura, rima.

أَرْجَفَهْ vulneratio.

أَرْجَفَهْ مُوْرَجَفَهْ vulneratus.

أَرْجَفَهْ مُوْرَجَفَهْ per modum vulnerationis.

أَرْجَفَهْ ardea, v. s. أَرْجَفَهْ.

أَرْجَفَهْ وَهَجَفَهْ fut. مُوْرَجَفَهْ observavit; it. expetivit, cfr. ar. صَفَى, properavit.

Pa. أَرْجَفَهْ observavit, custodivit.

Aph. أَرْجَفَهْ id.

أَرْجَفَهْ وَهَجَفَهْ v. s. أَرْجَفَهْ.

أَرْجَفَهْ زَبَقَهْ, ar. زَبَقَهْ, oleum e lilio extractum.

أَرْجَفَهْ حَنْبَلَهْ, pers. حَنْبَلَهْ, lunula, ornamenta lunæ formam referentia.

أَرْجَفَهْ زَمَنَهْ, ar. صَمَنَهْ, gummi, ut مُوْرَجَفَهْ.

أَرْجَفَهْ زَمَنَهْ, heb. זָמָן, ar. زَمَنَهْ, fut.

لُوْمَهٌ ligavit, coniunctit ;
obligavit *vulnus* ; لُوْمَهٌ حَنْتَهُ os confractum restituit ; it.
collegit ; cfr. *neo - ar.* صَمَدَ thesaurizavit. Part. act. لُوْمَهٌ ,
لُوْمَهٌ ; subst. pl. لُوْمَهٌ لِجِي textorii quibus ligantur telae ;
armarium. Part. pass. لُوْمَهٌ f. emph. et subst. لُوْمَهٌ collectio.

Pa. لُوْمَهٌ constrinxit, colligavit, collegit. لُوْمَهٌ حَفَّهُنَا accinxit. Part. pass. مُلْمَهٌ ; compactus.

Ethpa. لُوْمَهٌ حَدَّهٌ pass.

Aph. لُوْمَهٌ conjunxit,
لُوْمَهٌ colligatio ; it. ut seq.

لُوْمَهٌ fascia : fasciculus ; it.
vestiarium, cista nuptialis,
ar. صَمَدَ .

لُوْمَهٌ وَمَهْوَمَا conjunctio; occlusio oculorum defuncti.

لُوْمَهٌ وَمَهْوَمَا obligator vulnerum, ossa
confracta reficiens.

لُوْمَهٌ وَمَهْوَمَا conjunctim.

لُوْمَهٌ وَمَهْوَمَا colligatio ; conjunctio.

لُوْمَهٌ وَمَهْوَمَا colligatio; adverb. حَوْهَمَهٌ continuo.

لُوْمَهٌ مِنْجَنَهٌ ligans ; cohibens, coerci-

tivus.

لُوْمَهٌ مِنْجَنَهٌ colligatio.

لُوْمَهٌ حَدَّهٌ , heb. חַמָה , fut. لُوْمَهٌ

ortus est ; apparuit *lux*, splenduit ; trop. floruit. Part. præt. وَمَسْنَا splendens.

Ethpe. لُوْمَهٌ حَلَقَهٌ splenduit.

Pa. لُوْمَهٌ حَدَّهٌ prodire fecit, manifestavit.

Ethpa. لُوْمَهٌ حَلَقَهٌ illustratus est, splenduit.

Aph. لُوْمَهٌ حَدَّهٌ splendere fecit, illuminavit ; trop. oriri fecit, germinare fecit ; it. ut *Peal*, apparuit, splenduit.

Ettaph. لُوْمَهٌ حَلَقَهٌ illuminatus est ; it. luxit, splenduit.

لُوْمَهٌ germen ; splendor, radius solis ; trop. ap. gramm. elucidatio, explicatio.

لُوْمَهٌ حَدَّهٌ et لُوْمَهٌ حَدَّهٌ resplendens.

لُوْمَهٌ حَدَّهٌ politor.

لُوْمَهٌ حَدَّهٌ et لُوْمَهٌ حَدَّهٌ illuminatio, splendor.

لُوْمَهٌ حَدَّهٌ id. illuminatio, splendor.

لُوْمَهٌ حَدَّهٌ illuminatus.

لُوْمَهٌ حَدَّهٌ illuminatio.

لُوْمَهٌ , ar. أَصْمَهٌ surdus ; cfr. *ar.* صَمَهٌ obstructus aure fuit, surdus fuit.

لُوْمَهٌ gladius ; cfr. *ar.* صَمَادٌ .

لُوْمَهٌ foeditas, sordes.

لُوْمَهٌ حَمَنَهٌ , ar. gummi, ut لُوْمَهٌ حَمَنَهٌ .

لُوْمَهٌ حَمَنَهٌ sordes.

رَحْمَةٌ studium, factum, opus ; solertia, sapientia ; ars, artificium, fraus, machinatio.

رَحْمَةٌ perite, sapienter ; dolose.

رَحْمَةٌ versutia, prudentia ; dolus.

رَحْمَةٌ callidus.

رَحْمَةٌ callide.

رَحْمَةٌ calliditas.

رَحْمَةٌ dolose.

رَحْمَةٌ , pl. مُرَحْمَاتٍ artificium.

رَحْمَةٌ , pl. مُرَحْمَاتٍ cidaris, mitra, tiara ; amictus, amictus sacerdotis quem super caput tempore missæ imponit ; cfr. heb. رَحْمَةٌ , involvit, et ar. صِيفٌ capitinis velamen.

رَحْمَةٌ amictu velatus.

رَحْمَةٌ , pers. حَنَارٌ , platanus.

رَحْمَةٌ , emph. إِلَيْهِ رَحْمَةٌ et إِلَيْهِ رَحْمَةٌ , it.

رَحْمَةٌ , ar. حَنَارَةٌ , pl. رَحْمَاتٍ , hamus piscatoris ; it. in statu absol., aculeus.

رَحْمَةٌ inus. — Pa. رَحْمَةٌ inquinavit.

رَحْمَةٌ , f. رَحْمَةٌ spureus, immunndus ; رَحْمَةٌ , pl. رَحْمَاتٍ spureas.

رَحْمَةٌ latrina.

رَحْمَةٌ foede.

رَحْمَةٌ , pl. رَحْمَاتٍ sordes, excrementum ; turpitude.

رَحْمَةٌ , fut. رَحْمَةٌ sordidus fuit ; fœtuit. Part. præs. رَحْمَةٌ , fœtens. Part. præt. رَحْمَةٌ , fœtidus ; turpis.

Palp. رَحْمَةٌ maculavit, inquinavit. Part. pass. مُرَحْمَةٌ , foedus ; c. لِّ , incontaminatus, purus.

Ethpa. رَحْمَةٌ , pass. ; calumniis impetus est.

رَحْمَةٌ , pl. رَحْمَاتٍ fœditas ; macula, peccatum.

رَحْمَةٌ et رَحْمَةٌ f. , lanx, patena ; it. ar. صَاءٌ , mensura.

رَحْمَةٌ , heb. رَحْمَةٌ , ar. صَفَرٌ , fut. vilis factus est, despectus fuit ; cfr. رَحْمَةٌ . Part. pass. præt. رَحْمَةٌ , adj. vilis, ignominiosus, infamis ; subst. in pl. f. رَحْمَاتٍ viliora ; vitia.

Pa. رَحْمَةٌ probris affecit, dedecoravit ; stupravit, it. coivit cum muliere. Part. pass.

رَحْمَةٌ , مُرَحْمَةٌ ; adj. vilis, contemptibilis. مُرَحْمَةٌ سَاءَةٌ propudiosa, pudore carens mulier.

Ethpa. رَحْمَةٌ , pass.

رَحْمَةٌ contumelia, injuria, pro-

brum ; stupratio ; pudenda ;
مَكْهَدًا وَحْنَةً lapsum igno-
miniosum.

أَجْهَمَةً injuria.

أَجْهَمَةً ignominiose.

أَجْهَمَةً ignominia, injuria.

أَجْهَمَةً contumelia, injuria.

أَجْهَمَةً et مَوْجَهَةً ignominiose.

أَجْهَمَةً ignominia afficiens, stu-
prator, infamis, vilem artem
exercens.

أَجْهَمَةً opprobrium.

أَجْهَمَةً ignominiosus.

أَرْفَا , fut. نُورْفَا expurgavit,
ar. صَفَى .

Pa. أَرْفَقَ percolavit.

أَرْفَقَةً perflicatio, inunctio.

أَرْفَقَةً suggestum, id. ac
عَنْطَبَةً et ar. مُنْوَحَدًا .

أَرْفَا v. s. رُفَا .

أَرْفَبَا et رُفَبَا fascia ad colligan-
dos quaterniones codicium ;
ligamen ad usum textrinum ;
cfr. ar. صَفَاد vinculum, a
صَفَدَ constrinxit.

أَرْفَبَا al. رُفَبَا utriculus vini
stanneus.

أَرْفَقَةً , fut. نُورْفَسْ derepente
supervenit, irrupt ; invectus
est in, irruit in, adortus est ;
oppressit, invasit, c. حَلَّ ,

acc. nnq. c. حَلَّ ; transit., injec-
tit. Part. præs. رُفْسَا , رُفْسَةً ,
f. emph. رُفْسَةً , subst. v. infra.
Part. pass. رُفْسَةً ; f. emph.
رُفْسَةً , subst. lamina, ar.
صفحة .

Ethtaph. رُفْسَةً لَّا subito per-
culsus est.

Pa. رُفْسَةً subito et fortiter ag-
gressus est.

Parel رُفْسَةً colapho percussit.
رفسا casus improvisus ; it. scu-
tella, ar. صَبْنَةٌ ; pagina libri,
ar. صَبْنَةٌ .

أَرْفَقَةً se diffundens ; epidemi-
eus morbus.

أَرْفَقَةً , pl. رُفْتَهَا irruptio, ca-
sus improvisus ; trop. la-
queus, fulmen.

أَرْفَقَةً incursus, irruptio.

أَرْفَقَةً رُفَفَا colaphus.

أَرْفَقَةً رُفَفَا , sapo, ar. صَابُون .
أَرْفَقَةً et رُفَفَا , pl. رُفَفَةً ; it.
أَرْفَقَةً , pl. رُفَفَةً symphonia, per
extens., fistula musicæ in-
strumentum, sambuca ; tuba.

أَرْفَقَةً , fut. نُورْفَسْ arsit ; cfr. حَفَ .
Pa. أَرْفَقَةً ordinavit ; cfr. ar.
صفَّ ; it. saltavit.

أَرْفَقَةً et رُفَفَا , pl. رُفَفَةً ; it.
أَرْفَقَةً et رُفَفَا storea ; area ; gemma

annuli; ornatus, *cfr.* حَدْأً; *it.*
al. sensu, *v. s.* مُتَوْسِطٌ.
وَمَسْكٌ et زَانِمٌ, *v. s.* وَهُوَ.
وَقَدْفُوا, **وَقَدْفُو**, *conturbatus*.
وَقَدْفُوا et زَانِمٌ, **وَقَدْفُو** cippus,
compedes.

وَقْتٌ, vox ar. صَفَّ, ordines militum.

فَعَلَّ, **فَعَلَّا** ardens, incensus; ordinatus; gramm., gravis.

الْمُسَلِّمَاتُ; succensio.

رُفَّةً، رُفْتَهْ mane diluculum,
 tempus matutinum; *pl.* رُفَّاتْ رُفْتَهْ
 et رُفَّاتْ رُفْتَهْ; *adverb.* mane;
 حَدَّ رُفَّةً حَدَّ رُفَّةً vel حَدَّ رُفَّةً حَدَّ رُفَّةً
 singulis diluculis; مُنْ رُفَّةً مُنْ رُفَّةً a mane ad mane: in
 dies. حَمَّ رُفَّةً حَمَّ رُفَّةً diluculo. حَمَّ رُفَّةً حَمَّ رُفَّةً summo mane.

حَوْقَلْمًا matutinus ; *adv.* mane.

رُقْمَةٌ et رُقْمَاتٌ diliculum, aurora.
 رُقْمَةٌ c., pl. رُقْمَاتٍ, زَعْدَرَ, avis, passer; cf. heb. זָעַדֶר,
 ar. رُقْمَةٌ et رُقْمَاتٌ حَمْلَةً. عَصْفُورٌ struthiocamelus; al. رُقْمَةٌ مُّلَّا, زَعْدَرَ, luscinia. رُقْمَةٌ دِمْهَلَا avis aethionica: psittacus.

وَقْ turdus seleucis. وَقْ مَدْبُمْا
al. قَوْيَسْداً. مَهِنْداً sturnus.

ମୁହଁଙ୍ଗ *dim.*, avicula.

وَفْنَا، وَفْنَةٌ avium mercator.
وَفْنَةٌ، ar. صَفَرٌ، secundus ex
lunaribus Mahumadanorum
mensibus.

צָבֵד, c., hircus.

لَعْنَقٌ, pl. **لَعْنَقَاتٌ**, fem. præc., capra; it. lignum jugi quo bovis collum circumdat.

، ar. صَفَدْ، nomen aviculæ.

Ugo, v. s. *Ugo*.

جَوْفٌ forceps.

عَرْجَةٌ, v. s. **عَرْجَةٌ**.
عَرْجَةٌ clavus; trop. verruca;
 cfr. **عَرْجَةٌ** res prominens,
 similia et ar. **عَرْجَةٌ** acumen.

Pa. **ج** *v. denom.*, clavis infixit.

لَوْفَا، لَوْهُفَا et لَوْهُفَا، لَوْفَا .

رُوْذَا, ar. صَرَى, fut. نُرُوْذًا, decidit, scidit, disrupt; perrupit, inde trahit: intr. erupit.

Part. act. et præs. لَفْسُ , مَلْفُسٌ .

ئۆمە, f. ٣٩٧, ١٨٨ تىرىم sume

granum frumenti, sectumque
diligenter examina.

Ethpe. *וְתַגֵּל* pass.; *it.* denom.
ut Ethpa.

Pa. ۷ scidit, laceravit; dis-

رُفِعَتْ , <i>Part. act.</i> مَرْفُعًا .	صَرَخَ رُفِعَتْ , <i>Part. pass.</i> مَرْفُعًا .	صَرَخَ رُفِعَتْ , <i>Ethpa.</i> لَرْكَلْتْ <i>pass.</i> ; <i>it. denom.</i>
ab اَمْهَنْتْ <i>στριγνος</i> , libidi-	strepuit, clamavit;	strepuit, clamavit,
ni, voluptati indulxit; gavi-	<i>it. arsit</i> ; <i>trans. incendit.</i>	<i>et</i> لَوْفَسْدَا لَوْفَسْدَا , <i>it.</i>
sus est.		sonus stridens <i>aquilæ</i> , acci-
رُفَمْا , <i>pl.</i> لَرْقَمْا fissura, scissura;		pitrīs, etc.
rima, hiatus, foramen.		لَرْفَسْا fulgor.
رُفَمْا , <i>pl.</i> لَرْقَمْا <i>id.</i>		لَرْفَسْا accensus, ardens.
لَوْفَمْا , <i>pl.</i> لَوْفَمْا لَوْفَمْا , <i>pl.</i> لَوْفَمْا scissura, fragmentum.		
لَوْفَمْا scindens.		لَرْفَرْ , <i>ar. ضَرِيكَة</i> , <i>fut.</i> لَرْفَرْ ,
لَرْفَمْا scissura.		indiguit, inops fuit; <i>cfr. heb.</i>
مَرْفُعَةً disrumpens.		لَرْدَegestas. <i>Part. præt.</i>
لَرْفَمْا لَوْفَمْا qui disrumpitur, fis-		لَرْفَمْا , <i>inops</i> ; carens,
silis; <i>it. lasciviens.</i>		<i>c. لَهْ</i> .
لَرْفَمْا scissionis capacitas.		<i>Ethpe.</i> لَرْكَلْتْ ad inopiam re-
لَرْفَمْا cardui species.		dactus est.
لَوْفَمْا ferula <i>planta</i> , al., seselis		لَرْكَلْتْ indiguit.
herba, <i>vel</i> laserpitium.		<i>Aph.</i> لَرْكَلْتْ ad inopiam redegit;
لَرْفَمْا لَرْفَدَهْ ut seq.		<i>it. caudam motitavit canis.</i>
لَرْفَدَهْ bombyx.		لَوْهَفَتْ indigentia.
لَرْفَدَهْ in part. extans; <i>cfr. ar.</i>		لَرْفَدَهْ inopia.
لَرْدَ aberravit, declinavit a		
scopo sagitta; <i>it. cfr.</i> لَرْدَ .		لَرْفَرْ , <i>ar. صَرَمَ</i> , <i>fut.</i> لَرْفَرْ
لَرْفَمْا inclinans;		secuit, totondit; <i>it. constrin-</i>
tortus.		<i>xit</i> ; ausus est.
لَرْفَمْا fugit; circum-		<i>Aph.</i> لَرْفَلْ irruit audacter, li-
vagatus est.		bidinose, <i>c. لَكَ</i> .
لَرْفَمْا , <i>heb. ضَرِيز</i> , <i>ar. opobal-</i>		لَرْفَمْا amputatio; audacia.
samum; <i>it.</i> , <i>ar. سَرْز</i> , cypres-		لَوْهَفَتْ dens incisor.
sus.		لَوْهَفَتْ racemus fructuum pal-
		mæ; <i>it. audacia.</i>

أَلَبَّا *alabastrum, phiala,*
pers. حَرْمَيْتَةٌ .

بُومَرَخٌ *bombyx, murex, ut*
et لَفَحَهُمَا لَفَحَهُمَا .

صَرْعَةٌ *epilepsia, cfr. ar.*
id., et heb. نَسَدٌ *prostravit.*

عَرْفَةٌ *et لَفَدَا*, *ar.* ضَرَعٌ, *uber,*
mamma.

جَانِيَّةٌ *paxillus januæ, cfr.*
وصَرَاءٍ.

كَوْفَةٌ *et لَفَفٌ, heb.* נַסְעָדָה, *fut.*

نَفْعَهٌ *compressit, pupugit,*
cfr. ar. صَرَبٌ *constrinxit;*
it. anxit, afflictavit, crucia-

تَمَاثِيلُ *vixit, igne purgavit metallum;*
trop. expurgavit, purificavit.

مَذَاجِيَّةٌ *martyrem dolores probarunt. Part. act.*

نَفْعَمَّا *رُوفَمَّا, رُوفَمَّا:* num-

مَذَاجِيَّةٌ *رُوفَمَّا* me exagitat cor meum. Part.

أَنْفَعَةٌ *act.; subst., v. infra.*
Part. pass. **نَفْعَمَّا**; purgatus, igne examinatus, purus.

Ethpe. **أَنْفَعَةٌ** *pass.*

Pa. **أَنْفَعَةٌ** *anxit, vexavit, af-*
flifix; it. vim constrictivam

Ethpa. **أَنْفَعَةٌ** *pass. Part.*
مَنْفَعَةٌ cum alumine fabri-

Aph. **أَنْفَعَةٌ** *inflammavit; con-*

strinxit; pupugit, stimula-
vit; trop. repressit, coercuit;
afflictavit.

Ettaph. **أَنْفَعَةٌ** cruciatus est.

نَفْعَةٌ *purgatio; fornax ad me-*
talla probanda; compressio,
angustia; alumen.

نَفْعَةٌ *paropsis, catinus; confla-*
torium.

نَفْعَةٌ *conflator; constringens,*
stypticus.

نَفْعَةٌ *constrictio, vis cons-*
trictiva.

نَفْعَةٌ *constringens.*

نَفْعَةٌ *conflatio.*

نَفْعَةٌ *aurifex.*

نَفْعَةٌ *constrictio; constipatio.*

نَفْعَةٌ *constrictivus; it., ar.*
صَرَافٌ, nummularius.

نَفْعَةٌ *constrictio.*

نَفْعَةٌ *et مَنْفَعَةٌ astringens;*
pl. f. مَنْفَعَةٌ *res molestæ.*

نَفْعَةٌ مَنْفَعَةٌ *styptica.*

نَفْعَةٌ مَنْفَعَةٌ *vis constrictiva; acri-*
tas.

نَفْعَةٌ, *id. q. رُوفَمَّا.*

نَفْعَةٌ, *v. s. رُوفَمَّا.*

نَفْعَةٌ *bombyx, murex, ut*
لَفَحَهُمَا.

نَفْعَةٌ, *heb.* נַסְעָדָה, *fut.* نَسَدٌ, *im-*

per. نَسَدٌ, *constrinxit, conjun-*
xit; intrans., constrictus est;

cfr. ar. صَرَّ , fut. يَصْرِئُ constrinxit, et صَرَّ , fut. يَصْرِئُ striduit, usitat. in Ethpa. Part. act. et præs. لَمْ , لَمْ . Part. pass. لَمْ , لَمْ . Ethpe. لَمْ pass. Pa. لَمْ constrinxit. Ethpa. لَمْ pass.; it. striduit. لَمْ ligamen; fasciculus, marsupium, ar. صَرَّ , pl. لَمْ et لَمْ . لَمْ dim., marsupium parvum. لَمْ ap. Alchim., abbrev. لَمْ alumen schisticum seu laminosum. لَمْ et لَمْ , it.

لَمْ , pl. لَمْ , etc., ar. صَرَّ صَرَّ et صَرَّ , gryllus, sic dictus ob stridentem vocem. لَمْ frigus vehemens, ar. صَرَّ صَرَّ ventus frigidus. لَمْ artemisia planta, cfr. مَهْرُوفَا لَمْ lacerata; salamandra. لَمْ et لَمْ fructus tamaricis orientalis. لَمْ et لَمْ id.; cfr. pers. كَزْمَ لَمْ spina, proprie satureia, thymbra, origani species; it., ar. صَنَّ , thymus.

۶

۵ seu مُهْ undevicesima Alphabeti littera ; est littera emphatica ope palati pronuntianda.

1º Numerice valet : 100 ; مَ = 100000 ; مَ، centesimus ; it. مَ forma abbrev. est voc. مَكْمَنٌ paucus, et مَنْتَا lectio varia in codicibus.

2º Respondet heb. מَ et ar. مَ : مَ، مَ، قَامَ stetit; nnq. *equivalat hebr. مَ*; مَ، نَسْتُورٌ mus, *pronuntiatur a Nestor.*; *insuper sonat uti مَ ante لَ aspirat. apud Occident, et ante لَ durum et مَ apud Nestor.*, ex. g. : مَ، مَ، مَ، et مَ، مَ، مَ، sonat مَ، مَ، مَ، sonat مَ، ap. Nestor.; it. apud istos lenitur مَ uti لَ، ita نَحْدَهُ fit نَحْدَهُ.

2º Reddit communiter *κ. græc.* : مَ، δ κανών, مَ، مَ، Cyrilus, nnq. γ. : مَ، γαράνωμα valum.

مَالٌ, vox tartar. خان, ar. rex. مَاجِهٌ مَلٌ contract. a regis minister.

مَاجِهٌ مَلٌ, v. مَاجِهٌ مَلٌ et مَاجِهٌ مَلٌ, pl. مَاجِهٌ مَلٌ، area; capsula, cista, loculus . مَاجِهٌ مَلٌ et مَاجِهٌ مَلٌ، وَمَاجِهٌ مَلٌ area foederis. مَاجِهٌ مَلٌ مَاجِهٌ مَلٌ arca vitalis, epitheton B. V. Mariæ. مَاجِهٌ مَلٌ dim., arcula.

مَاجِهٌ مَلٌ canalis. مَاجِهٌ مَلٌ ardens. مَاجِهٌ مَلٌ et مَاجِهٌ مَلٌ، juxta: مَاجِهٌ مَلٌ مَاجِهٌ مَلٌ γένος, in genere.

مَاجِهٌ مَلٌ، v. مَاجِهٌ مَلٌ. مَاجِهٌ مَلٌ ادَّعَى، aprehensio, deductio.

مَاجِهٌ مَلٌ et مَاجِهٌ مَلٌ، مَاجِهٌ مَلٌ، instauratio. مَاجِهٌ مَلٌ امْكِنَةٌ مَجْهُوَّةٌ مَاجِهٌ مَلٌ اخْرَاجُورِيُّسْ، cataclysmus ; diluvium.

مَاجِهٌ مَلٌ اخْرَبِيُّسْ، nomen cantus liturgici.

مَاجِهٌ مَلٌ اخْرَيِيُّسْ، procella. مَاجِهٌ مَلٌ اخْرَيِيُّسْ etc. مَاجِهٌ مَلٌ، catalepsia.

مَلْكُوكَه مَلْكُوكَه . id. q. مَلْكُوكَه .
مَلْكُوكَه نَخْرُوكَهْرِيُون , ha-
bitaculum.

مَلْكُوكَه v. مَلْكُوكَه .

مَلْكُوكَه نَخْلَهْ , usurpat. c. مَلْكُوكَه ,
نَخْلَهْ پَرَادِسِ , venditio aucto-
rata.

مَلْكُوكَه مَلْكُوكَه نَخْلَهْ , ar. قَلْمَر ,
calamus, arundo.

مَلْكُوكَه نَخْلَهْ , stipula.

مَلْكُوكَه نَخْلَهْ , calamin-
tha herba.

مَلْكُوكَه et مَلْكُوكَه , cancamum,
species suffimenti.

مَلْكُوكَه , مَلْكُوكَه f. , نَجْمَهْ ,
camus, capistrum.

Pa. مَلْكُوكَه verb. denom., camo
strinxit.

مَلْكُوكَه nomen piscis.

مَلْكُوكَه incantatores.

مَلْكُوكَه نَسْبَهْ , thesaurus.
مَلْكُوكَه نَخْرَبَهْ , larva, eruca.

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , ar. قَنْبَهْ ,
cannabis sativa.

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , catanan-
ce planta.

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , cenota-
phia.

مَلْكُوكَه resina ; cfr. نَسْنَسَهْ , id.

مَلْكُوكَه , مَلْكُوكَه et مَلْكُوكَه f. ,
chald. كَرِدَه , cassis, galea.

مَلْكُوكَه نَخْرَبَهْ , castanea.
مَلْكُوكَه v. مَلْكُوكَه .

مَلْكُوكَه , pl. مَلْكُوكَه lat., caput,
capita; sensus.

مَلْكُوكَه , pers. - ar. cam-
phora.

مَلْكُوكَه , vox ar. قَاضِي , judex.
مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , adusta
terra.

مَلْكُوكَه lentes.

مَلْكُوكَه cacalia planta (gall.
chervis).

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , caecias nomen
venti.

مَلْكُوكَه et مَلْكُوكَه , ar. قَرْعَهْ , cucurbita.
مَلْكُوكَه مَلْكُوكَه aquila.

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , carabus
(gall. crabe).

مَلْكُوكَه , مَلْكُوكَه . id. q. مَلْكُوكَه .

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , cor.
مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , astutus.

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , careum planta.
مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , nux arbor et
fructus.

مَلْكُوكَه et مَلْكُوكَه , plumbus, cfr.
نَحْرُونَهْ , Saturni et plumbi no-
men.

مَلْكُوكَه et مَلْكُوكَه plumbi
scoria.

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , concha mar-
rina.

مَلْكُوكَه نَخْنَخْبِيَهْ , cornutus.

مَلْكُوكَه , v. s. مَلْكُوكَه .
مَلْكُوكَه مَلْكُوكَه فُرْقَهْ , fruc-
tifer.

فَعْدَمْهُ مَادَهْ مَادَهْ مَادَهْ مَادَهْ مَادَهْ مَادَهْ
carpesium
lignum aromaticum.

فَأَمْأَفَهْ vox elata et aspera.

فَمَاهْ مَاهْ pers. جَيْرِي vas sinense.

فَمَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ
linea perpendicularis.

فَمَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ
v. *مَاهْ مَاهْ*.

فَمَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ
et *catheter, instrumentum chirurgicalum.*

فَمَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ
etc., v. s. *مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ مَاهْ*.

مَحَلٌ, heb. *מַחְלָה*, ar. قَبَّةٌ, et
جَبَّا, fut. *نَعْمَلَ* collegit, con-
gregavit; inclusit, continuit
vas rem; *intrans.* se colle-
git, memoriam rei servavit.
Part. act. *مَحْلًا*, *مَحْلًا* ;
emph. et subst. *مَحْلًا ut*
مَحْلًا. Part. pass. *مَحْلًا*,
مَحْلًا; stagnans *aqua*; spissus,
coagulatus *sanguis*; pl. emph.
مَحْلَاتٍ *ut مَحْلَةٌ* q. v.

Ethpe. *مَاحَلَتْ* pass.

Ethpa. *مَامَلَتْ* se collegit, la-
tuit.

مَحَنَّا collectio, copia; concretio
humorum, abscessus; stag-
num.

مَحَنَّا id.

مَحَنَّا, pl. *مَحَنَّاتٍ*; it. *مَحَنَّا*,
pl. *مَحَنَّاتٍ* stagnum, cisterna,
cfr. *مَهْمَدَهْ* et ar. جَبَّا.

مَهْمَدَهْ collectio.
مَهْمَدَهْ, ar. قَبَّةٌ, tunica virilis.
مَهْمَدَهْ uleus, tumor.

مَهْمَدَهْ, fut. *نَعْمَهْ*, arcuatus
fuit, ar. قَبَّهْ ; it. subrecti sunt
pili, ar. قَفَّهْ. Part. *مَادَهْ* ;
emph. et subst., v. *infra*.
Part. præt. *مَحْنَهْ* arcuatus,
fornicatus.

Pa, ar. *مَحَنَهْ*, arcuavit.
Ethpa. *مَامَحَنَهْ* horruit, tremuit
præ frigore vel metu.

مَهْمَدَهْ septum, arca, cista; ute-
rus; it. *κάρος*, heb. *מִזְבֵּחַ*, nomen
mensuræ aridorum.

مَهْمَدَهْ fornix; concavitas.
مَهْمَدَهْ tremor febrilis.
مَهْمَدَهْ, **مَهْمَدَهْ** arcuatus, forni-
catus, per modum fornicis
circumdans.

مَهْمَدَهْ f., emph. *مَهْمَدَهْ*, pl.
مَهْمَدَهْ, ar. قَبَّةٌ, fornix, arcua-
tum opus, tholus; taberna-
culum, heb. *מַחְלָה*; trop. vor-
tex; it. in pl., cisterna, cfr.
مَهْمَدَهْ.

مَهْمَدَهْ tremor febrilis; it. ar-
cuatus.

مَهْمَدَهْ signum viæ indicandæ
causa erectum.

مَهْمَدَهْ et *مَهْمَدَهْ* spuma juris.

مَهْمَدَهْ, v. s. *مَهْمَدَهْ*.

﴿٦٤﴾, cfr. ar. قَبِلَ et قَبْلَ ex adverso fuit, fut. ﴿٦٥﴾ accusavit, inculpavit, conquestus est de, c. ﴿٦٦﴾, causam dixit apud, c. acc., ﴿٦٧﴾, vel لِمَنْ ; حَمْدَهُ اتَّهَمَ eum apud Deum incusavit, contra illum Deum obtestatus est; it. nnq. ut Pa. ar. قَبِلَ et Pi. v. لَكَ, accepit. Part. pass. مَحْدُلٌ ; oppositus.

Pa. ﴿٦٨﴾ cepit, sumpsit, accepit, suscepit; exceptit hospites, obviam ivit alicui; recepit, admisit, baptizatum e fontibus exceptit; in se suscepit, spec. c. ﴿٦٩﴾, accepit; inde c. مُّ pers., rem gessit, approbavit, consensit, annuit; sibi proposuit. ﴿٦١﴾ manuum impositionem, h. e. ordinationem recepit. ﴿٦٢﴾ litem suscepit. ﴿٦٣﴾ accepit fidem datam. ﴿٦٤﴾ مَحْمَدًا gratias egit. ﴿٦٥﴾ ei obtemperavit. ﴿٦٦﴾ مَحْمَدًا peinas solvit. ﴿٦٧﴾ اَهَمْكَمْ دَهْنَاهْ ecce concipies. Part. act. ﴿٦٨﴾ مَحْتَدٌ ; مَحْدُلٌ , مَحْمَدٌ ﴿٦٩﴾ servi pecuniam per-

cipientes, exactores. Part. pass. ﴿٦٥﴾, مَحْدُلٌ ; gratus, conveniens, c. ﴿٦٦﴾ pers.

Ethpa. ﴿٦٧﴾ pass.

Aph. ﴿٦٨﴾ excepit; ex adverso fuit; objicit, obviam ire fecit; occurrit; adfuit; ut acceptam commendavit rem; it. accepit. ﴿٦٩﴾ فَرَقَهُ مَحْمَدًا ei obviam ivit; aspexit. ﴿٦٧﴾ اَهَمْكَمْ اَهَمْكَمْ id. sibimet obviam tulerunt.

Saphel. ﴿٦٩﴾ obviam fuit, adiit, c. لَهُ ; aggressus est hostem; it. adesse curavit.

Estaph. ﴿٦٩﴾, ar. اِسْتَقْبَلَ, occurrit, adfuit; casu adstitit, accidit res, contigit.

﴿٦٦﴾ accusatio.

﴿٦٦﴾, مَحْدُلٌ : 1º subst., aspectus, id quod ante oculos obversatur, cfr. مَحْدِلٌ ; it. in statu emph., chamaemelon planta.

2º adverb. et more præposit. usurpt. c. مُّ : ﴿٦٧﴾ مُّ ex adverso, e contra; procul; ﴿٦٨﴾ سَعَ مَحْدُلٌ, v. s. سَعَ ; it. c. ﴿٦٩﴾, مَحْدُلٌ contra, obviam; versus, erga, adversus; pler. c. suff. اَهَمْكَمْهُ , حَمْدَهُهُ , مَحْدَهُهُ , حَمْدَهُهُ et raro حَمْدَهُهُ ex adverso

ejus, etc., contra, versus.
لَمْ يَكُنْ بِسْعَةً bestiae occurrit; c. *cæteris vero suff. usurpatur* **أَلْيَهُ** alia scriptio ejusdem formæ: **كَمْ حَدَّ**, **كَمْ حَدَّفْتُمْ**, **كَمْ حَدَّتُمْ**, **كَمْ حَدَّهُمْ**, **كَمْ حَدَّهُنَّ** ante, coram, erga me, vos etc. **كَمْ حَدَّ** **وَكَمْ حَدَّ** *vel* **كَمْ حَدَّ** **وَكَمْ حَدَّ** ante se *scu* recta incidentes; *trop.* relate ad, præ; *juxta*. **كَمْ حَدَّ** **وَحَادِهِ** contradicatio. **كَمْ حَدَّ** **وَحَادِهِ** sub vesperam.

3º *Ex c. præf.* effor-
mantur *adjectiva et alia de-*
rir, qui contra, qui ex adverso
est, contrarius, adversarius,
hostis. **وَكَمْ حَدَّ** *id*; *an-*
nomast. diabolus; **وَكَمْ حَدَّ**
hostes ejus; **وَكَمْ حَدَّ** ii
verò qui ex adverso sta-
bant. **مِنْ هُنَّ** **وَكَمْ حَدَّ** ab iis
qui erant ex parte adversa;
adverb. **قِبَلَةً**, **وَكَمْ حَدَّ** e
contrario; **جَنَاحَةً** **وَكَمْ حَدَّ** adversus hoc.

وَكَمْ حَدَّلَمْ contrarie; con-
dictorie.

وَكَمْ حَدَّكُنْ contrarius; subst.
in pl. f. **وَكَمْ حَدَّكُنْ** contradic-
tiones.

وَكَمْ حَدَّكُنْ contrarietas: op-

positio, hostilis ratio agendi.
وَكَمْ حَدَّ verb. *denomin.* a
وَكَمْ حَدَّ, restitit, repugnavit,
contradixit.

Ethpa. **أَلْيَهُ** *id.*

لَمْ يَكُنْ contrarie, contradic-
torie.

لَمْ يَكُنْ oppositio.

لَمْ يَكُنْ *et* **مَحْلَمْ**, ar. **قَابَةٌ**, ob-
stetrix.

مُحَدَّلٌ accusator.

لَمْ يَكُنْ *et* **مَحْلَمْ** oppositus.

مَحْلَلٌ acceptio; receptio; pre-
tium admissionis; convivium;
trop. approbatio. **مَحْلَلٌ**
وَكَمْ حَدَّ hospitium. **مَحْلَلٌ** **وَكَمْ حَدَّ**
وَكَمْ حَدَّ hospitalitas. **مَحْلَلٌ** *وَكَمْ حَدَّ *وَكَمْ حَدَّ *وَكَمْ حَدَّ gratiarum ac-
tio; beneficium. **مَحْلَلٌ** **وَكَمْ حَدَّ** vigilia festi.***

مَحْلَلٌ facies, aspectus.

مَحْلَلٌ casus adversus; casus
fortuitus.

مَحْلَلٌ contrarius; adversa-
rius; *it.* **مَحْلَلٌ** *et* **مَحْلَلٌ** subst. occursus; *trop.* res ad-
versa. **مَحْلَلٌ** *وَكَمْ حَدَّ* sibi
ipsi non contradicit.

مَحْلَلٌ ex adverso, contra-
rie.

مَحْلَلٌ, **مَحْلَلٌ** adversa-
rius, sententiam contrariam
sustinens; contraria res; *pl.*

- f.** مَحْدُكْتَمٌ contraria, res oppositae.
- ا** مَحْمَدَكْتَمٌ actio adversandi ; oppositio. مَعْمَدَكْتَمٌ antiphrasis.
- ا** مَمْدَكْتَمٌ receptio.
- ا** مَمْدَكْتَمٌ accipiens ; hospes ; capax recipiendi ; susceptor, patrinus *in Baptismo*, f.
- ا** مَمْدَكْتَمٌ accipiens ; subst. receptaculum ; stola sacerdotalis.
- ا** مَمْدَكْتَمٌ acceptio, receptio ; potentia obedientialis.
- ا** مَمْدَكْتَمٌ et مَمْدَكْتَمٌ id. q. præc.
- ا** مَمْدَكْتَمٌ qui accipitur, accep-
tabilis.
- ا** مَمْدَكْتَمٌ adversarius.
- ا** مَمْدَكْتَمٌ contrarie.
- ا** مَمْدَكْتَمٌ oppositio.
- ا** مَمْدَكْتَمٌ ex adverso.
- ا** مَحْدَنٌ leontice, leontopetalum *planta*.
- ا** مَحْدَنٌ et مَحْدَنٌ saccharum album.
- ا** مَحْدَنٌ qui nuntium felicem affert, evangelista.
- ا** مَحْدَنٌ , pers. كَنْتٌ, colocynthis.
- ا** مَحْدَنٌ , fut. نَعْمَدَنٌ et نَعْمَدَنٌ fixit, infixit ; posuit, erexit, constituit ; coagmentavit, fir-
mavit. مَكْنَةٌ nidificavit avis. Part. pass. مَكْنَةٌ , مَكْنَةٌ ; adj. fixus, firinus, stabilis ; trop. intenta mens. بِمَكْنَةٍ مَكْنَةٌ sanguis coagulatus. مَكْنَةٌ مَكْنَةٌ aquæ conge-
lateæ ; f. مَكْنَةٌ subst. v. inf. Ethpe. مَكْنَةٌ pass. ; لَمَكْنَةٌ مَكْنَةٌ cruci affixus est.
- ا** مَكْنَةٌ infixit ; incrustavit.
- Ethpa. مَكْنَةٌ pass. ; trop. fir-
matus est *ordo*.
- ا** مَكْنَةٌ fixio, infixio ; erectio ; coagmentatio, *in pl.* مَكْنَةٌ , al. مَكْنَةٌ , fasciæ ornamento affixæ manicis vestium, *vel* collari.
- ا** مَكْنَةٌ fixe.
- ا** مَكْنَةٌ ap. Alchim., fixatio cor-
porum volatilium.
- ا** مَكْنَةٌ fixio, erectio, compac-
tio ; stabilitas, firmitas ; trop. erectio *mentis seu attentio*.
- ا** مَكْنَةٌ et مَكْنَةٌ بِمَكْنَةٌ festum Tabernaculo-
rum, Scenopegia.
- ا** مَكْنَةٌ آفَّةٌ physiognomia.
- ا** مَكْنَةٌ , pl. كَوْبِيَّاتٌ مَكْنَةٌ , heb. מִקְנָה , ar. قَبْةٌ , pileus, cucullus, galea ; capitellum *columnæ* ; calix *florum*, ar. قَمَّةٌ ; in pl. fodinae metallorum.
- ا** مَكْنَةٌ dim., cuculla nigra.

ignis, arsit ; *trop.* exarsit, recruduit *error*; *trans.* ignem e silice extraxit; accedit ; *it.* perforavit, *ar.* قَدَّرَ ; هَبَّ evulsit crines in signum luctus. *Part. pass.* هَمْسَةً ; *emph. et subst.*, هَمْسَةً pruna, focus.

Ethpe. هَبَّ مَهْلَكٍ accensus est ; perforatus est.

Pa. هَبَّ accedit ; incidit.

Aph. هَبَّ مَهْلَكٍ accedit ; laceravit, incidit.

هَبَّا , *ar.* قَنْجَر , rima, foramen ; *ap.* Alchim., *ar.* قَنْجَر , patera. هَبَّا , et هَبَّا eductio ignis e silice ; irruptio cataractae ; eruptio florum, plantarum ; perforatio, foramen ; *it.* ut seq.

هَبَّادَةً , *pl.* هَبَّادَةً evulsio crinium in signum luctus.

هَبَّامَةً accensio ignis.

هَبَّامَةً terebra.

هَبَّانْتَا dolor pungens (*gall.* élancements).

هَبَّانْتَا perforatio.

هَبَّا مَهْلَكٌ , *ar.* قَدَّال , cervix ; tergum. هَبَّا مَهْلَكٌ dura cervice : procax.

هَبَّانْتَا cervicalis.

هَبَّا , *heb.* = حَرَق , *ar.* قَدَّم , *fut.*

هَبَّا , anteivit ; præcessit, præivit, *c.* هَبَّ accus. et *ninq.* هَبَّ vel *c.* acc. ; *seq. al.* verbo prioritatem significat, respondet scilicet sensui verbor. græc. et latin. quibus præposit. πρό et præ præfiguntur ; هَبَّ لَيْسَ هَبَّا هَبَّا هَبَّا unusquisque suam cœnam præsumit ad manducandum, *i. e.* prius edit. *Part. præt.* هَبَّ pro quo usitat. forma verbal. هَبَّ q. v.

Pa. هَبَّا prævenit, antecessit, præcessit ; præcedere, prævenire fecit. هَبَّا دُوْقَنَا et هَبَّا diluculo surrexit ; *it. abs.* هَبَّا mane surrexit ; *seq. al.* verbo æquivalet adv. prius, statim et præp. præ in comp. verb. latin. : هَبَّا هَبَّا antea dixit ; prædictit. هَبَّا هَبَّا cito aufugit. هَبَّا هَبَّا eum Deus morte præoccupavit. هَبَّا هَبَّا præposuit, præfecit ; *it. vel* هَبَّا هَبَّا prædefinivit. هَبَّا هَبَّا prædictum est ; *ninq. c. conj.* هَبَّا هَبَّا هَبَّا præmonstravit. *Part. act.* هَبَّا هَبَّا ; هَبَّا هَبَّا هَبَّا هَبَّا هَبَّا invicem honore prævenientes. *Part. pass.* هَبَّا هَبَّا هَبَّا هَبَّا هَبَّا

antecedens ; **أَمْبَدُهُمْ مَدْهُمْ** præscientia **مَدْهُمْ مَدْهُمْ** verba præfata : prophetiæ.

Ethpa. **أَمْلَأِي** præventus est ; præoccupatus est *delicto* ; *it.* prævenit. **أَمْلَأِي** prædictus est. **أَمْلَأِي مَهْبَهْ بِهِ** eum mors præcepit.

كَسْفَتَهُمْ, **مَهْمَنْهُمْ** antecessio ; **كَسْفَتَهُمْ مَهْمَنْهُمْ** panes propositionis ; *pler.* *in stat.* *const.* usurpat. *uti præpositio ante,* coram, *ar.* **قَدَّامَهُ**; *c. suff.* **مَهْمَتْهُ**, **مَهْمَنْهُمْ**, **مَهْمَنْهُمْ**, **مَهْمَنْهُمْ**, etc. ante me, nos, te, etc. **أَمْلَأِي مَهْمَنْهُمْ** in conspectu solis ; *c. præf.* **كَمْ بِهِ** *id* ; *c. مَهْ*, a, longe a, ante; ex, propter ; **أَمْلَأِي مَهْ بِهِ** ante quam sacerdotio fuisse ornatus. **مَهْمَنْهُمْ** prædecessor tuus ; *adverbial.*, **أَهْمَنْهُمْ** olim. **أَهْمَنْهُمْ** heri. **أَهْمَنْهُمْ** antiquitus. **أَمْلَأِي مَكْنَهُمْ** et **أَهْمَنْهُمْ** paulo ante. **كَمْ بِهِمْ** ante eum. **أَلِي** **كَمْ بِهِمْ** progressus est ; *it. usurp. uti conjunct.* : **أَهْمَنْهُمْ** antequam, priusquam. **أَهْمَنْهُمْ** *id.*

أَهْمَنْهُمْ, **مَهْمَنْهُمْ** primus, prior, antiquus ; *pl.* **كَبْهَتَهُمْ** veteres. **أَهْمَنْهُمْ** primum

quemque interrogarunt ; *adverb.* **حَمْمَهُمْ** primum, initio. **فُتْهُمْ فُتْهُمْ** *vel* **فُتْهُمْ فُتْهُمْ** prior Konoun seu December mensis, *ar.* **كَوْنُونَ الْأَرْوَى**.

حَمْمَهُمْ, **مَهْمَنْهُمْ**, *f. emph.* **أَهْمَنْهُمْ** primus, prior *tempore, ordine* præses ; *c.* **مَهْ** *compar.*, anterior ; *pl.* **فَتْهَمْهُمْ** seniores, principes ; *subst. in f. emph.* initium, principium, *pl.* **أَهْمَنْهُمْ** gesta antiqua ; *adverb.* **مَهْمَهُمْ** primum, primo ; *id.*, in initio ; **أَمْلَأِي مَهْمَنْهُمْ** antiquitus ; *it. in st. const. f.* **مَهْمَنْهُمْ** *ut seq.*

مَهْمَنْهُمْ primo, primum ; primo.

مَهْمَنْهُمْ præcedens ; *sæpius more præpos. usurp. c. præf.* **مَهْ**, ante, prius ; *adverb.* **مَهْمَنْهُمْ** *vel* **مَهْمَنْهُمْ** ab initio, olim.

أَهْمَنْهُمْ, **مَهْمَنْهُمْ** præcedens ; prior *tempore, ordine* ; antiquus. **كَبْهَتَهُمْ** prædestinatus. **أَهْمَنْهُمْ** *وَهْمَنْهُمْ* quod antea constitutum erat. **مَهْمَنْهُمْ** **أَهْمَنْهُمْ** eos antecedebat.

مَهْمَنْهُمْ prioritas.

كَبْهَتَهُمْ antecessio, prioritas *tempore, ordine* ; *in compos.* *c. al. nom.* *respondeat præpos.* græc. πρό et lat. pro,

præ : مَقْبُلٌ مُقْدَمٌ propositio,
et ap. gramm., præpositio.
فَرِيقٌ مُقْدَمٌ profestum ; vigilia.
أَحْبَابٌ مُقْدَمٌ amor præveniens.
فَرِيقٌ مُقْدَمٌ præfiguratio ; gramm.,
مُقْدَمٌ adverbium.
فَرِيقٌ مُقْدَمٌ et فَرِيقٌ مُقْدَمٌ præcedens.
فَرِيقٌ مُقْدَمٌ, *formæ cum suff. adhibita*, pars anterior, frons ; *st. const. fem. مَوْهَدٌ et masc. pl. مَهْدٌ* *uti præposit. usurpanatur* ; *c. suff. مَوْهَدٌ*, *مَهْدٌ*,
مَهْدٌ, *مَهْدٌ*, *مَهْدٌ*, *مَهْدٌ*,
مَهْدٌ etc., ante me, te etc. ; *مَهْدٌ* fugit e conspectu meo ; *formæ vero femininæ مَهْدٌ suffixa non adjunguntur.* مَلْكٌ ante regem ; *it. adverb. c. مَلْكٌ*, mutato loco vocalis o ; مَلْكٌ antea, prius. مَلْكٌ olim ; in pl. vero servata in suo loco vocali لَكْمَهْدٌ olim. مَلْكٌ مَهْدٌ ab antiquo tempore, quondam.
فَرِيقٌ مُقْدَمٌ *adv. usurp. c. مَلْكٌ*,
فَرِيقٌ مُقْدَمٌ vice priori, primum.
فَرِيقٌ مُقْدَمٌ a fronte, ex anteriori parte.
فَرِيقٌ مُقْدَمٌ anticipatio ; præsumptio, præjudicium.
فَرِيقٌ مُقْدَمٌ anterior.

الْمَقْدَمَةُ antecessio, prioritas ;
in compos, id. q. مَقْبُلٌ مُقْدَمٌ.
مُقْدَمٌ præpositio.
مُقْدَمٌ præscientia.
مُقْدَمٌ examen prævium.
مُقْدَمٌ præcedens.
مُقْدَمٌ præcedenter ; primario.
مُقْدَمٌ anticipatus, præversus.
مُقْدَمٌ antecessio, præoccupatio ; præjudicium.
مَلْكٌ مَلْكٌ et مَلْكٌ Academia ; *it. καλδυείχ*, calmia, chalcitis (*gall. calamine*).
مَلْكٌ κάλδος, ar. قَذَس, lebes, olla ; *it. galea ænea*.
فَرِيقٌ – *Pa. فَرِيقٌ* fastidivit, tædit.
Ethpa. فَرِيقٌ ut Pa.
الْمَهْدَةُ, pl. الْمَهْدَاتُ cucullus.
فَرِيقٌ discolor ; tortuosus, *inde subst.*, serpens.
الْمَهْدَةُ καὶ δεκάτη, et decima,
فَرِيقٌ – *Pa. فَرِيقٌ* disrupt.
Ethpa. فَرِيقٌ pass.
فَرِيقٌ f. γύρωρα, ar. قذر, olla, lebes, pl. فَرِيقٌ, فَرِيقٌ ; *it. ricinus*.
الْمَهْدَةُ dim., olla parva.

مَبْرُوْدًا ollarum fabricator, figuratus.

مَهْبُوْدًا machina bellica.

مَبْرُوْدٌ, v. مَبْرُوْدَةٌ.

مَجْدٌ, *inus.*, *cfr. heb.* שָׁדֵךְ, *ar.* تَعْظِيْمٌ, purus, sanctus fuit.

Pa. **مَجْدٌ** sanctum, purum fecit; sanctificavit; sanctum prædixit; usui sancto *rem adhibuit*; consecravit *rem, eucharistiam*; *seq.* مَهْبُوتٌ *vel abs.*, sacrum obtulit *sacerdos*; sacramento matrimonii conjunxit.

Ethpa. مَاجِدٌ pass.

مَهْبُوتٌ, *emph.*, **مَهْبُوتاً**, *pl.* **مَهْبُوتاً**, sanctitas; res sacra, sanctificata; sacrificium; oblatio, *spec. in pl.*; locus consecratus, sanctuarium, templum, fanum. **مَهْبُوتاً** Sanctum Sanctorum; مَهْبُوتاً *id., inde etiam pars sacra victimarum; adject.*

c. præc. nomine in st. const.

vel c. præf. وَرَوْقِيْمَا: sanctus: *vel* مَهْبُوتاً *وَمَهْبُوتاً*

spiritus sanctitatis: Spiritus Sanctus.

Sanctæ Scripturæ; مَبْرُوكَةٌ civitas sancta, Je-

rusalem, *ar.* الثَّنَسٌ. مَهْبُوتاً idololatra.

مَهْمَلٌ وَمَهْمَلٌ urbs sancta. مَهْمَلٌ dies meus sanctus.

مَهْمَلٌ et مَهْمَلٌ sanctus.

مَهْمَلٌ, مَهْمَلٌ, مَهْمَلٌ cantus Trisagii, trina repetitio vocis مَهْمَلٌ; consecratio; oblatio, mysteria eucharistica, sancta missa, (*inde neo-ar.* قَدَّاسٌ) كَمْلَهْمَلٌ, مَهْمَلٌ, مَهْمَلٌ, مَهْمَلٌ, مَهْمَلٌ, مَهْمَلٌ, مَهْمَلٌ, M. sancta Eucharistia; *pl.* مَهْمَلٌ *id.*

مَهْمَلٌ, مَهْمَلٌ, f. مَهْمَلٌ, مَهْمَلٌ, pl. مَهْمَلٌ, مَهْمَلٌ, sanctus; purus; *inde subst.*, virgo, angelus, vir pius. مَهْمَلٌ مَهْمَلٌ saneta mysteria eucharistica. مَهْمَلٌ لَّكَنْتَ pro tu Deus sanctus, in Trisagio; *inde subst.* مَهْمَلٌ Trisagium. حَمَدَ مَهْمَلٌ sanctuarium, et præposit. inter sanctos. مَهْمَلٌ in omnibus sanctus: sanctissimus. مَهْمَلٌ مَهْمَلٌ حَمَدَ sanctissima Virgo Maria. أَمْكَنَتْ مَهْمَلٌ vitex, agnus castus.

مَهْمَلٌ sanete.

مَهْمَلٌ sanctitas; virginitas; it. Sanetitas, titulus honoris.

مَهْمَلٌ, *pl.* مَهْمَلٌ, *emph.* مَهْمَلٌ, *ar.* ثَدَّاسٌ, inauris; monile; amuletum.

مَهْمَلٌ idololatra.

مَدْحُومًا, *heb.* מַדְחָמָה, *ar.* مَقْدَسَ, sanctuarium; مَدْحُومًا id.

مَدْحُومًا sanctificatio.

مَدْحُومًا sanctificans; qui Trisagion prædicat; consecrans *mysteria*; sanctificator; quod validitatem *Sacramenti* perficit.

مَدْحُومًا sanctificatio.

مَدْحُومًا sanctificandus.

مَدْحُومًا consecratio.

لَوْمَه et **لَوْمَه**, *heb.* לִזְמֹה, fut. لَوْمَه hebes factus est *dens*; obtusum evasit *ferrum*; obstupuit; *cfr. ar.* قَهْرَه abhorruit *a cibo*. Part. *præs.* لَوْمَه, لَوْمَه. Part. *præter.* لَوْمَه, لَوْمَه hebes.

Aph. لَوْمَه hebetavit *dentes*, *ferrum*, etc.; *trop.* repressit, *dolorem* lenivit.

لَوْمَه, مَلْمَه stupor dentium, hebetudo.

لَوْمَه id.

مَلْمَه, مَلْمَه, it. مَلْمَه, مَلْمَه κέδρος, pl. مَلْمَه et مَلْمَه cedrus.

مَلْمَه, مَلْمَه κεδρέα, oleum cedrinum.

مَلْمَه et مَلْمَه κεδρίδες, fructus cedri.

مَلْمَه et مَلْمَه cedrinus.

لِمْلُوكْتَه κέδυματα, pustulæ.

لَوْمَه, *heb.* לִזְמֹה, fut. لَوْمَه congregatus est, convenit, c. لَهُ apud aliquem; it. *trans.*, congregavit.

Ethpe. لَوْمَه pass.

Pa. لَوْمَه collegit, coacerlavit, congregavit.

Ethpa. لَوْمَه pass. et refl.

Aph. لَوْمَه ut *Pa.*

لَوْمَه, مَلْمَه congregatio.

لَكْلَمَه clamore multitudinem congregans, inde contentiosus, rixosus. لَكْلَمَه اِلْمَلِه mulier clamosa.

لَكْلَمَه contentio, rixa.

لَكْلَمَه in unum convenire faciens multitudinem.

لَكْلَمَه, *heb.* כָּהֵלָה, Koheleth, auctor libri Ecclesiastis.

لَكْلَمَه, v. لَكْلَمَه.

لَكْلَمَه, v. مَلْمَه.

مَلْمَه κέγγηρος, panicum, milium.

لَكْلَمَه κέστρον, cestron planta (gall. bétoine).

لَكْلَمَه κεφάλαιον, summa.

لَكْلَمَه et لَكْلَمَه, pl. لَكْلَمَه κεφαλή, caput; *trop.* caput libri.

لَكْلَمَه et لَكْلَمَه succinum, electrum, *ar.* كَهْرَبَة.

مَهْمَهٌ et مَهْمَهٌ rostrum avis,
cfr. بَرْ.

مَهْرَهٌ saltatio.

مَهْمَهٌ inus., cfr. مَهْمَهٌ.

Ethpa. مَهْمَهٌ erupit in clamores; it. *denom a seq.*, germinavit.

مَهْمَهٌ caulis, stipes; surculus; herba.

مَهْمَهٌ clamor; exsultationis vel ejulatus clamores.

مَهْمَهٌ murmur aquarum.

مَهْمَهٌ, fut. مَهْمَهٌ absorptus est.

مَهْمَهٌ, v. s. مَهْمَهٌ.

مَهْمَهٌ, heb. حِيْزِكِيَّة, ar. حِيْظَة, aestas; اَهْمَهٌ tempus aestivum.

مَهْمَهٌ v. *denom.*, tempus aestivum transegit.

مَهْمَهٌ aestive.

مَهْمَهٌ aestivus, f. مَهْمَهٌ; مَهْمَهٌ tomi partis aestivae *Officiorum liturgicorum*.

مَهْمَهٌ مَهْمَهٌ خُرَبَلْجَدَوْن, cotyledon *planta*; it. catinus.

مَهْمَهٌ ludus latrunculorum; ap. Alchim., costus *planta*.

مَهْمَهٌ مَهْمَهٌ خُرَبَلْجَدَوْن, flos mali puniceæ; pl. مَهْمَهٌ مَهْمَهٌ خُرَبَلْجَدَوْن, mala punica minora.

مَهْمَهٌ مَهْمَهٌ خُرَبَلْجَدَوْن, oleaster.

مَهْمَهٌ مَهْمَهٌ خُرَبَلْجَدَوْن, cytisus *planta*.

مَهْمَهٌ مَهْمَهٌ خُرَبَلْجَدَوْن, cochlea, limax; it. trop. cochlea, prelum; instrumentum torturæ.

مَهْمَهٌ مَهْمَهٌ خُرَبَلْجَدَوْن et مَهْمَهٌ مَهْمَهٌ خُرَبَلْجَدَوْن, cochleæ similis, tortuosus.

مَهْمَهٌ مَهْمَهٌ cochlea, instrumentum torturæ.

مَهْمَهٌ, inus., cfr. ar. قَالَ, dixit, enuntiavit.

مَهْمَهٌ, heb. קֹל, pl. מִקְתָּה, vox; per extens., strepitus, sonitus, clangor, dictum, verbum, ar. قَوْل; مَهْمَهٌ وَّاَكْهَارٌ vel abs. مَهْمَهٌ vox Dei: tonitru; liturgice, cantus, hymnus; tonus cui conformari debet cantus; trop. مَهْمَهٌ مَهْمَهٌ vox signi: monitum, c. *præp.* تَ,

مَهْمَهٌ secundum tonum, metrum; مَهْمَهٌ id.; adverb. حَمَلَ مَهْمَهٌ intenta voce; حَمَلَ مَهْمَهٌ distincte. مَهْمَهٌ idem tonus.

مَهْمَهٌ et مَهْمَهٌ, pl. مَهْمَهٌ filia vocis: vox; sonus; vocabulum, dictum, effatum. مَهْمَهٌ sine voce: mutus; gramm., مَهْمَهٌ مَهْمَهٌ, مَهْمَهٌ consonans.

مَهْمَهٌ vocalis: sonorus. مَهْمَهٌ

مَكْتُنَةٌ vocalis vel semivocalis (scil. ل, ئ, و) ; **مَكْتُنَةٌ لِّلْكَوْنِ** consonans. **مَكْتُنَةٌ حِيَّةٌ** ad vocales pertinens; verbalis.

مَكْتُنَةٌ vocalibus instructio.

مَهْمَةٌ et **مَهْمَةٌ**, pl. **مَهْمَةٌ** et **مَهْمَةٌ**, membrum; trop. membrum phrasis.

مَهْمَةٌ imp. v. **مَهْمَةٌ**.

مَهْمَةٌ, **مَهْمَةٌ**, v. s. **مَهْمَةٌ**.

مَهْمَةٌ **خَلْوَةٌ**, cavitas; ulcus in cornu oculi.

مَهْمَةٌ **خَلْوَةٌ**, colum, intestinum crassum. **مَهْمَةٌ** dolor ventris.

مَهْمَةٌ vox lat., colonia.

مَهْمَةٌ **خَلْوَةٌ**, resina, sic dicta ab urbe unde asportabatur.

مَهْمَةٌ **خَلْوَةٌ**, cucurbita, pepo.

مَهْمَةٌ f., **خَلْوَةٌ**, colocynthis.

مَهْمَةٌ **خَلْوَةٌ**, **مَهْمَةٌ** et **خَلْوَةٌ**, **مَهْمَةٌ** **خَلْوَةٌ**, ordo, series.

مَهْمَةٌ **خَلْوَةٌ**, cylindrus. **مَهْمَةٌ** **خَلْوَةٌ**, intestinorum dolor (gall. colique).

مَهْمَةٌ **خَلْوَةٌ**, colchicum planta.

مَهْمَةٌ, v. s. **مَهْمَةٌ**.

مَهْمَةٌ **خَلْوَةٌ**, colossus, nomen ingentis statuæ.

مَهْمَةٌ **خَلْوَةٌ**, sinus.

مَهْمَةٌ et **خَلْوَةٌ**, nomen mensuræ.

مَهْمَةٌ, heb. **אָפָּה**, ar. **قَامَ**, fut.

مَهْمَةٌ, surrexit, stetit; it. **ab-sol. c. اَفْ** expletivo: **مَهْمَةٌ** **خَلْوَةٌ** surge: **مَهْمَةٌ** **خَلْوَةٌ** erectus stetit; it. exstitit, erectus est, stabilitus est, constitutus est; resurrexit; trop. floruit, perstitit, permansit; c. **اَفْ rei**, versatus est, perstitit in, constans fuit; institutus operi, perfecit illud; a re pendit. **مَهْمَةٌ** **خَلْوَةٌ** regnum suscepit, regnavit. **مَهْمَةٌ** **خَلْوَةٌ** **خَلْوَةٌ** verba fecit ad populum; c. **اَفْ pers.**, præpositus est: adjuvit, opitulatus est; vindicavit; substitut, inde c. **سَرَّ**, quievit, liberatus est; destitut, cessavit; it. constitut; سُرَّ فَهُمْ مَهْمَةٌ a morbo convaluit; c. **حَلَّ**, obviam ivit; it. praefuit; c. **حَلَّ** vel **اَفْ pers.**, insurrexit, obstitut; restitut; **مَهْمَةٌ** **خَلْوَةٌ**; comprehendit, assecutus est scientiam. **مَهْمَةٌ** **خَلْوَةٌ** verbo h. e. promissis stetit; **مَهْمَةٌ** **خَلْوَةٌ** et **مَهْمَةٌ** **خَلْوَةٌ** ei (provinciæ) præpositus est; c. **حَلَّ**,

conflixit, congressus est; c.
pers. et restituit; servivit. vel abs. succes-
sit; seq. al. verbo aequivalet
adverb. constanter. **لَوْلَوْ** eum constanter ac-
cusat. Part. act. **لَوْلَمْ**,
لَمْ stans, præsens, exstans;
quod igni restituit; **لَمْ** spinas eradicantes;
constanter **لَمْ** constat; subst. **لَمْ** et f. emph. **لَمْ**,
v. infra. Part. præt. **لَمْ**; impers. **لَمْ**;
لَمْ apud principes
non steti h. e. non fui.

Ethpe. مُتَّهِمٌ constitutus est.
Pa. مُتَّهِمٌ erexit, stabilivit, con-
 stituit; sustentavit. مُتَّهِمٌ
 حَفَّتْهَا æstimavit. مُتَّهِمٌ بَنَى
 ecclesias ædificavit. مُتَّهِمٌ مُحْكَمٌ
 bellum iniit. *Part. act.* مُتَّهِمٌ,
 مُهَمَّقْتَهُ ; مُهَمَّقْتَهُ ; مُهَمَّقْتَهُ
 orthodoxyæ defensores. *Part.*
pass. مُتَّهِمٌ, مُهَمَّقْتَهُ ; stabilis,
 subsistens, constans *in re*.

Ethpa. ~~مُؤْلِي~~ *pass.*; substit.

Aph. **خَمْرٌ**, *fut.* **خَمْرٌ** surgere,
stare fecit; excitavit, susci-
tavit, resurgere fecit; sta-

tuit, stabilivit, constituit,
præposuit; *trop.* instituit,
erudivit *aliquem*, certiorem
fecit, *c.* **reī**; *prolem* gene-
ravit; *intrans.* perstitit, per-
severavit, curam habuit, ob-
secutus est, *c.* **حَكْمَهُ**; *liturgice*,
intonuit *diaconus*. **أَمْمَهُ** **كَرْمَهُ**
كَلْمَهُ eum in pugnam commi-
sit. **أَمْمَهُ** **كَرْمَهُ** partem, factio-
nem constituit, *et per extens.*
rebellavit. **أَمْمَهُ** **وَمَلِّ** judicium
exercuit. **أَمْمَهُ** **كَعْكَهُ** pe-
cuniæ summam promissam
complevit. **أَمْمَهُ** **مَهْمَهُ** jura-
mento stetit. **أَمْمَهُ** **كَنْتَهُ**
vel **أَمْمَهُ** **كَمْكَهُ** eum præ-
posuit illis. **أَمْمَهُ** **وَحْنَهُ** suo
proposito firmiter stetit; *it.*
alterius jussum perfecit. **أَمْمَهُ**
مَهْمَهُ feedus pepigit. **أَمْمَهُ** **مَهْمَهُ**
bellum commisit. **أَمْمَهُ** **وَهْكَهُ**
persecutionem movit. **أَمْمَهُ**
كَهْ كَهْ كَهْ dejicit eum a so-
lio *regni* sui.

فهـ actus standi, surgendi;
statio, status, mansio; statio
lunæ, etc; erectio *Stylitarum*
in *columnis*, ipsa colum-
na; sessio, vacatio *muneri*,
administratio; *liturgice*, vigi-
liæ noctis in partes divisæ;
officium divinum; stabili-

tas, quies ; statura, *per extens.*, ulna mensura ; vas ; insurrectio, rebellio ; turba, ar. قوم ; gramm., nomen accentus in phras. حَتَّى مَهْمَة ejudem staturæ, coætanei. مَهْمَة, pl. مَهْمَات, مَهْمَات c. suff. مَهْمَة, مَهْمَة statura, *per extens.* ætas ; mensura ; it. erectio. دَهْمَهْمَة ad adultam ætam pervenit. حَتَّى مَهْمَة ejusdem ætatis, coætanei. مَهْمَة statio militum ; vacatio ad officium, ipsum officium ; constitutio, dogma, res statuta, inde tempus constitutum, signum ; pactum, fœdus ; institutum, professio vitæ clericalis, asceticæ vel cœnobiticæ ; *per extens.* clerus, cœtus religiosam vitam profitentium ; حَنَّة مَهْمَة clericali vitæ adscriptus ; canonicus, religiosus, monachus, pl. حَتَّى مَهْمَة ; f. حَتَّى مَهْمَة virgines Deo dicatae, diaconissæ ; moniales ; it. حَنَّة مَهْمَة geom., dimensio. مَهْمَة surrectio, resurrectio mortuorum ; coll., mortui resurgentes. حَبَابُ وَمَهْمَة festum Resurrectionis ; مَهْمَة dies resurrectionis :

dies dominica ; it. statio militum, stabilimentum ; pars statuta, stipendum, pl. مَهْمَات . مَهْمَات ad resurrectionem pertinens. مَهْمَات, st. emph. f. مَهْمَة, columna ; it. in f. pl. مَهْمَات, مَهْمَات, cippus, statua ; postes januæ ; culmus segetis, ipsa seges nondum demessa, heb. חַטָּב ; مَهْمَات وَمَهْمَات hostile seu acies stimuli. مَهْمَات مَهْمَات constitutio ; vel abs. مَهْمَات ars canendi, musica. مَهْمَة, f. مَهْمَة stans, assistens ; inde antistes, præfector, curator, inspector, dispensator, patronus ; trop. stabilitor, columen. مَهْمَة, مَهْمَة columen est spei. مَهْمَة مَهْمَة stabiliendi vim habens. مَهْمَة مَهْمَة præsidium ; præfectura, administratio. مَهْمَة, مَهْمَة perstans, subsistens, stabilis ; manens, restans ; superstes ; مَهْمَة مَهْمَة per quinque annos adhuc durabit fames. مَهْمَة مَهْمَة forma verbalis, stans, permanens. مَهْمَة, مَهْمَة stabilimentum, sustentatio, victus ; robora-

tio, confirmatio; subsistentia;
ipsa substantia; *nnq.* status,
forma *rei*; definitio, sistema.
مَعْنَى وَهُوَ v. s. **هُوَ**.

مُعْتَدِل *actus standi, sessio, con-*
sessus, ar. **مقام**.

رَأْسَ الْمُهَاجِرِ reapse.

مُحَمَّد *constituens, stabiliens,
stabilitor; constitutivus.*

Laserdo constitutio; firmitas.

لِيْسَدْ erigens; suscitator;
fundator; astringens *medicina*;
ap. *gramm.*, nomen
accentus.

Le^on^om^o suscitatio; institu-
tio.

Laisse L'An erectio.

سَمْل, vox ar. سَمْل, computus anni.

|خَادِمٌ, خَادِمَةٌ, it. خَادِمٌ,
خَادِمَةٌ, خَادِمَةٌ, خَادِمَةٌ et
خَادِمَةٌ f., خَادِمَةٌ, gummi.

ଲେଥାର୍ଜୀଆ lethargia.

መስቀል እና የመስቀል ተክክለኛ ስም አርቡትስ የመስቀል ተክክለኛ ስም አርቡትስ

|Loֹמֶדֶת, |Loֹמֶדֶת xωμωδία,
comœdia; irrigatio.

لِمَّا مُهَمَّ ، لِمَّا مُهَمَّ *id.* ; satira.

مُوْنِيْر vox lat., com-
monitorium.

Անոմ, Անոմ հօμինոս, co-
meta.

مَوْلَى *lat.*, comitatus imperatoris; stipatores ejus.

ወደዚህ አባላት ተስፋዎች, cœmenterium.

प्राप्तिः उत्तरः

كُمُون مَوْهَمْتَمْ *cuminum herba*.

comes, *titulus dignitatis* (gall. comte); pl. **فُوْنِيْسْتَادْ**; it. v. **فُونْدَوْ**.

|^{أَنْدَادِ}^{مَهْكُومَةٍ} et |^{أَنْدَادِ}^{فَلَامِعَةٍ}, ar. قميص, camisia, tunica.

Līfiom vox lat., comitia-
nus, officialis comitis.

لَوْكَسَةَ lat., comitissa.

ለመመ, መመመ እውነንና,
comicus.

لَهْوٌ لِلْمُنْهَدِّفِ *vox lat.*, commentatoris, custos carceris; officialis.

بِرْمَة comaris, *compositio al-chimica.*

لِمَدْنَه vestis sacerdotalis, *cfr.*
لِمَدْنَه: *it.* capitellum columnæ.

الْمَوْسُ, et al. forma مَوْسٌ, κυάνεος, cæruleus, fuscus, pl.

radix lilii cærulei.

- | | |
|---|--|
| præc., pl. مَنْهَا vel مَنْتَاه in præter. tantum extans, lividus, fuscus fuit. Part. pass. | etc. κίνναμον, cinnamomum. |
| مَنْتَاه, pl. f. مَنْتَاه lividus. | مَهْدَه et مَهْدَه مَهْدَه κῶνος, conus geometricus; conus cedri; it. thymelæa planta. |
| مَنْدَلَة color viridis. | مَهْدَه conicus. |
| مَنْدَلَة radix lilii cærulei. | مَهْدَه مَهْدَه κωνίστρος, rubus caninus. |
| مَنْدَلَة color cæruleus, color fuscus, nigrescens; opacitas. | مَهْدَه مَهْدَه et مَهْدَه مَهْدَه exiliū; it., κυνόσαργες, canis albus. |
| مَنْدَلَة id. | مَهْدَه مَهْدَه vox lat., comes stabuli (gall. connétable, ar. قَنْد اسْطَبْل). |
| مَنْدَلَة etc. κυνίγγη, angina gutturis (gall. esquinancie). | مَهْدَه κωντάξιον, pl. مَهْدَه مَهْدَه κωντάξιον, granum seu nux pini. |
| مَنْدَلَة et مَهْدَه asclepias planta. | مَهْدَه κωντάξιον, pl. مَهْدَه مَهْدَه κωντάξιον, venator; vigil nocturnus. |
| مَنْدَلَة κωντάξιον, venatio; ludus circensis cum bestiis; pl. مَهْدَه مَهْدَه . | مَهْدَه κωντάξιον, pl. مَهْدَه مَهْدَه κωντάξιον, contus, lancea, hasta; in pl. meteora ignea. |
| مَهْدَه κωντάξιοن, contus, hasta. | مَهْدَه κονίξ, lixivium; cinis. |
| مَهْدَه , v. مَهْدَه مَهْدَه . | مَهْدَه vestis pontificalis, cfr. مَهْدَه . |
| مَهْدَه κόνταξ, hasta. | مَهْدَه κώνιον, conium maculatum, cicuta; radix arboris iemanensis; nomen piscis eujusdam. |
| مَهْدَه مَهْدَه lat., conditum mel. | مَهْدَه مَهْدَه κόνοντον, aconitum. |
| مَهْدَه κόνταξ, lusus hastæ; it. vel مَهْدَه مَهْدَه κοντάξιον, libellus; hymnorum species. | مَهْدَه مَهْدَه κονίλη, origanum planta. |
| مَهْدَه κονόβιον, cœnobium. | مَهْدَه f., cfr. τὸ κοινόν, cœtus, turma, concilium. |
| مَهْدَه κόνυζا, conyza planta. | مَهْدَه κονικός, cynicus, caninus; Cynicus philosophus; curator canum; it. convulsio canina. |
| مَهْدَه pro مَهْدَه مَهْدَه ئِقْوَنُوس, مَهْدَه مَهْدَه , مَهْدَه مَهْدَه , | |

مَهْمَنْتُمْ	Cynicus.	مَهْمَفْهُمْ	κόπος, labor, defatigatio.
مَهْمَنْتَكَهْ	κογγύλη, conchylia.	مَهْمَفْهُمْ	κοῦρος, mutus.
مَهْمَنْتَهْ	, v. هَنْدَمْ .	مَهْمَفْهُمْ	ar. قِيَطْ , genus placen-
مَهْمَنْتُمْ	vox lat., concentus.	مَهْمَفْهُمْ	torum.
مَهْمَنْتَهْ	κόσυμβιοι, fimbriæ.	بَوْبُ	bubo, cfr. مَهْمَفْهُمْ .
مَهْمَنْتَهْ وَمَا	vox lat., custodia ;	مَهْمَفْهُمْ	κόφινος, ar. قَنْيَةْ , cophi-
مَهْمَنْتَهْ وَمَا	الْمَأْوَى pœna capitatis.	نُسْ	nus.
مَهْمَنْتَهْ وَمَا	et مَهْمَنْتَهْ etc., costus planta odorifera.	مَهْمَفْهُمْ	lat., compendiaria via.
مَهْمَنْتَهْ وَمَا	pers. كَسْتِيك , كَسْتِيج ,	مَهْمَفْهُمْ	κύβος, pl. لَعْنَقْ , cu-
مَهْمَنْتَهْ وَمَا	cingulum.	مَهْمَفْهُمْ	bus ; lapillus ; capsa, cfr. ar.
مَهْمَنْتَهْ وَمَا	, v. مَهْمَنْتَهْ .	مَهْمَفْهُمْ	قَصْ ; mensura metrica ; it.
مَهْمَنْتَهْ وَمَا	κύδων, neol. κοῦσ-	مَهْمَفْهُمْ	πος, genus compedium.
مَهْمَنْتَهْ وَمَا	πος, genus compedium.	مَهْمَفْهُمْ	in pl., latrunculorum ludus
مَهْمَنْتَهْ وَمَا	pars media nasi ; capi-	مَهْمَفْهُمْ	(gall. jeu de dés ou d'échecs).
مَهْمَنْتَهْ وَمَا	tella columnarum.	مَهْمَفْهُمْ	ad latrunculos perti-
مَهْمَنْتَهْ وَمَا	— Pa. مَهْمَنْتَهْ debilitavit.	نَدْرَهْ وَمَهْمَفْهُمْ	nens.
مَهْمَنْتَهْ وَمَا	Aph. مَهْمَنْتَهْ instituit rei; attendit.	مَهْمَفْهُمْ	κύψελος, avis apud
مَهْمَنْتَهْ وَمَا	pl. تَفْهُمْ vectis, fere-	مَهْمَفْهُمْ	apes nidificans, cypselus,
مَهْمَنْتَهْ وَمَا	trum ; sporta ; cfr. مَهْمَنْتَهْ ; it.,	مَهْمَفْهُمْ	apus (gall. martinet).
مَهْمَنْتَهْ وَمَا	heb. מִזְבֵּחַ , pers. كَبِي , simia ;	مَهْمَفْهُمْ	cfr. neo-gr. κόπασσις ,
مَهْمَنْتَهْ وَمَا	it. et emph. مَهْمَنْتَهْ , sporta ;	مَهْمَفْهُمْ	et neo-ar. قَبَاز , tunica lanea.
مَهْمَنْتَهْ وَمَا	pala annuli (gall. chaton) ;	مَهْمَفْهُمْ	مَهْمَفْهُمْ , ar. كَفْر , bitumen ; cfr.
مَهْمَنْتَهْ وَمَا	it. medicamenti species ; it.	مَهْمَفْهُمْ	مَهْمَفْهُمْ .
مَهْمَنْتَهْ وَمَا	v. s. مَهْمَفْهُمْ .	مَهْمَنْتَهْ	v. den., bitumine obduxit.
مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	sportas bajulans; bajulus.	مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	مَهْمَفْهُمْ κύπειρος, cyperum.
مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	κύπειρος, cyperum.	مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	κύπριον, æs cyprium ;
مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	κουφόλιθος, pu-	مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	it. κύπριον έλαιον, oleum e
مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	mex (gall. pierreponce).	مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	cypro confectum.
مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	rete ad columbas capien-	مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	des. مَهْمَفْهُمْ κόπρος , firmus.
		مَهْمَنْتَهْ وَمَهْمَفْهُمْ	مَهْمَفْهُمْ finetum.

- مَهْمَهْ** κυπάρισσος, cypressus *arbor*; *it.* κυπαρισσίας, euphorbiæ species.
- مَهْمَهْ** vitriolum, *cfr.* مَهْمَهْ ficedula *avis* (*gall.* bec-figue); alauda (*gall.* alouette).
- مَهْمَهْ**, *v. s.* مَهْمَهْ .
- مَهْمَهْ** *f.*, emph. مَهْمَهْ , *pl.* مَهْمَهْ , مَهْمَهْ urna; *in pl. f.* cellæ apum; *it. m.*, κόκκος, bacca.
- مَهْمَهْ** figulus; placenta; *it. genus* cantici. مَهْمَهْ minus figulorum.
- مَهْمَهْ** ars figuli.
- مَهْمَهْ**, *a sono* مَهْمَهْ formatum *verb.*, crocitavit; *cfr. ar.* قَوْدَارْ corvorum sonus.
- مَهْمَهْ** κόκκαλος, nux pinea, *seu* fructus pini.
- مَهْمَهْ** κόκκαλις, caucalis planta.
- مَهْمَهْ** cuculus *avis* (*gall.* coucou).
- مَهْمَهْ** et مَهْمَهْ vox lat., cucullium.
- مَهْمَهْ** κοκκύμηλον, coccy-melum, prunum.
- مَهْمَهْ** κόκκος, coecus.
- مَهْمَهْ**, *cfr.* مَهْمَهْ , poculum.
- مَهْمَهْ** κυκλάμινος, cyclamen herba.
- مَهْمَهْ** κύκλος, circulus.
- مَهْمَهْ** κύκλιον, cyclicus cantus.
- مَهْمَهْ** hymni in processione cantandi.
- مَهْمَهْ** circularis.
- مَهْمَهْ** in orbem.
- مَهْمَهْ** rotunditas.
- مَهْمَهْ** κύκνος, cygnus, *pl.* مَهْمَهْ .
- مَهْمَهْ** frigus, *v. s.* مَهْمَهْ ; *it.* medulla palmæ.
- مَهْمَهْ** et deriv. *v. s.* مَهْمَهْ .
- مَهْمَهْ**, ar. قُرْآن, Coranus.
- مَهْمَهْ** κόραξ, corvus.
- مَهْمَهْ** κορημاتخ, scopæ.
- مَهْمَهْ**, neo-gr. κουροπαλάτης, praefectus palatii.
- مَهْمَهْ** κροκόδειλος, crocodilus.
- مَهْمَهْ**, *v. s.* مَهْمَهْ .
- مَهْمَهْ** verruca.
- مَهْمَهْ** etc. κάρδουν, lepidium planta (*gall.* cresson).
- مَهْمَهْ** κορυδαλλός, alauda.
- مَهْمَهْ** et مَهْمَهْ κόρυζخ, pituita.
- مَهْمَهْ** pallium laneum.
- مَهْمَهْ**, *v. s.* مَهْمَهْ .
- مَهْمَهْ** vox lat., curator, tutor, sponsor, *pl.* مَهْمَهْ , مَهْمَهْ etc.

اِفْرِيْتٌ officium sponsoris,
 curatoris.
 اِفْرِنْتٌ f., vox lat., cortina.
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ , domine.
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ , dominus.
 اِفْرِمْتٌ domina.
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ اِلْعَجْسُونٌ ,
 Kyrie eleison, Domine miserere nobis.
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ , cori-andrum
 plantula.
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ et اِفْرِمْتٌ poculum.
 اِفْرِمْتٌ , v. s. اِنْ .
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ , coris planta ;
 cimex (gall. punaise).
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ , dominicus.
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ , dominica dies.
 اِفْرِمْتٌ grus avis, cfr. اِفْرِتٌ , et
 ar. قَرْبَى avis aquatica.
 اِفْرِمْتٌ etc. اِفْرِمْتٌ ,
 corallium.
 اِفْرِمْتٌ v. s. اِنْ .
 اِفْرِمْتٌ vox pers., vestis dupli-cata.
 اِفْرِمْتٌ , chald. כָּרְנִיתָ , origa-num planta.
 اِفْرِمْتٌ اُخْرِيْسٌ , neo - ar. مُرْتَسٌ ,
 clava, malleus.
 Palel اِفْرِمْتٌ v. denom., malleo
 percussit.
 اِفْرِمْتٌ etc. اِفْرِمْتٌ ,
 plantago, coronopus.
 اِفْرِمْتٌ , v. s. اِنْ .

اِفْرِنْتٌ , v. اِنْ .
 اِفْرِنْتٌ vox lat., curcuma, capistrum.
 اِفْرِنْتٌ , v. s. اِنْ .
 اِفْرِنْتٌ , imp. v. اِنْ .
 اِفْرِنْتٌ , v. اِنْ .
 اِفْرِنْتٌ , v. اِنْ .
 اِفْرِنْتٌ , inus., cfr. ar. قَزْ abhorruit.
 Ethpa. اِفْرِنْتٌ abhorruit.
 اِفْرِنْتٌ horror, abominatio.
 اِنْ , pers. ar. قَزْ et خَرْ , se-ricum.
 اِنْ , ar. قَرْازٌ , serici mercator.
 اِنْ nomen avis.
 اِنْ f., emph. اِنْ cantharus.
 اِنْ id.
 اِنْ nauclerus ; auriga.
 اِنْ emaciatus ; it. egenus.

 اِنْ , inus. - Palp. اِنْ risit,
 ar. قَهْةٌ et قَهْةٌ ; it. ridere fecit.
 Ethpa. اِنْ murmuravit
 aqua.
 اِنْ paropsis, poculum, cfr.
 اِنْ .
 اِنْ palea ad sternumentum
 adhibita, al. cete.
 اِنْ id.
 اِنْ , fut. اِنْ circumivit,
 vagatus est; circumactus est;
 circumjactatus est; seq. اِنْ ,

persecutus est. *Part.* *præs.*
فَهُنَّا مُكْلِسُوا دَلَّا وَمُهَنَّدُوا; **مُهَمَّا**,
 super caput ejus sal consper-
 gitur. **مَهْمَماً قَبْرَ مُهَمَّا** gyrum
 explanto sole.

Aph. $\text{—}\delta\omega\text{i}$ circumire fecit,
circumvertit: *tron.* turbavit.

Pau. **كَفَّ** coacervavit; cfr.
ar. **كَلَّ** collegit.

କ୍ଷେତ୍ର circuitus.
କ୍ଷେତ୍ରାଚ୍ୟବ୍ସୁ acervus.

كَفَّا et **كَافِرًا** **نَاتَّا**, secundum,
juxta. **كَافِرًا** **نَاتَّا** **وَنَاتَّا**,
solus.

لِفَمْ, ar. لِفَنَّة, st. لِفَمْ,
pl. لِفَنَّاتَهُ cucumberarium.

مَهْتَ, *inus.*, cfr. *ar.* **قَطْب** frontem corrugavit *in signum iræ.*

Pa. ۲۵۰ irritavit.

حُفْزٌ irritatio.

مَحْدُّ, ar. قُطْب, polus.

etc. καταβιβάζων,
pars inferior Zodiaci.

፩፻፭፻ እናተጠግኗሚነት, pactum
scriptum.

Ἄλειψός κατέδυος, reus.

mulcta, poena.

دَرْجَاتٌ وَمُهَاجِرٌ et مَلَكٌ مَنْ يَرِيدُ
δρομος cursus, impetus; it.
studium.

اَنْفُسُهُمْ , وَ اَنْفُسُهُمْ c. , emph. اِنْفُسُهُمْ ,
ar. اَنْفُسُهُمْ , feles ; pl. اِنْفُسٌ et
اِنْفُسٌ .

Líoó *dim.*, feles parva ; *it.*
psyllium, plantago.

ପର୍ବତୀ dim., parva feles.

|દૂસરી dim., id.

لِفْنَه *ut* **لِفْنَه**.
لِفْنَه *linum*, *cfr. ar.* كَتَان et arm.
لِفْنَه *id.*

தூஷ்ட comminuit, contrivit.
புஷ்ட comminutus; debilis,
 impotens.

መ.ኩስ fractus.

μέτακλησις κατηγοριαὶ εἰσεῖσθαι,
conclave ad catechumenos
destinatum.

መተዳደሪያ እና ስራተኞች, creator.

κατήγορις, catechesis, instructio, catechismus.

وَلَمْ, *heb.* קָנַת, *ar.* قَنَلْ, *fut.* لَمْ تَعْمَلْ, *imper.* لَمْ تَعْمَلْ, *infin.* لَمْ تَعْمَلْ, *cum aff.*

مُهَكِّمٌ ، مُهَكْمَمٌ etc. pl.
مُهَكْمَمٌ ، مُهَكْمَمٌ etc., oc-
cedit, mactavit. Part. act.

۷۴۰ مُهَكَّتٌ كَتَبَوْا ; مُهَلَّا se
in vicem interficiens. مُهَكَّةٌ
الْحَسْنَى prophetarum inter-
fectrix, *Jerusalem*. ۷۴۱ مُهَمَّهٌ
نَفْعًا sibi mortem consciens ;
trop. schismaticus ; ۷۴۲ مُهَمَّهٌ
أَوْدَادٌ occidens patrem : ar-
butus, unedo. ۷۴۳ مُهَمَّهٌ occi-
dens lupum : λυκοντόνος ,
aconitum. Part. pass. ۷۴۴ مُهَمَّهٌ
emph. et subst. مُهَلَّا cada-
ver, ar. قَيْلَلٌ .

Ethpe. ۷۴۵ مُهَلَّا pass.

Pa. ۷۴۶ مُهَمَّهٌ plures interfecit, tru-
cidavit ; concidit, debellavit
hostes.

Ethpa. ۷۴۷ مُهَلَّا pass.

۷۴۸ مُهَمَّهٌ cædes, interfactio.

۷۴۹ مُهَمَّهٌ , f. ۷۵۰ مُهَمَّهٌ occisor, morti-
fer ; homicida. ۷۵۱ مُهَمَّهٌ ar-
bor e qua colligitur ladanum.

۷۵۲ مُهَمَّهٌ et deriv. , v. s.

۷۵۳ مُهَمَّهٌ .

۷۵۴ مُهَمَّهٌ homicidium.

۷۵۵ مُهَمَّهٌ id.

۷۵۶ مُهَمَّهٌ occisor, peremptor.

۷۵۷ مُهَمَّهٌ interficiendus.

۷۵۸ مُهَمَّهٌ et ۷۵۹ مُهَمَّهٌ اَوْتَلَّا , cotyle,
parva mensura liquidorum.

۷۶۰ مُهَمَّهٌ اَوْتَلَّا اِسْرَائِيلٍ , qui

mensura cotyliis utitur, insti-
tor (gall. marchand en dé-
tail).

۷۶۱ مُهَمَّهٌ a græco καταλαμβά-
νειν et aorist. καταλαβεῖν ,
occupavit, detinuit ; operam
navavit, confinxit.

Ethpa. ۷۶۲ مُهَلَّا occupatus est,
laboribus distentus est.

۷۶۳ مُهَمَّهٌ occupatio, studium.

۷۶۴ مُهَمَّهٌ sollicitus.

۷۶۵ مُهَمَّهٌ κατάλυσις , reconciliatio.

۷۶۶ مُهَمَّهٌ , ar. قَطَّ , fut. مُهَمَّهٌ
abscidit.

Ethpe. ۷۶۷ مُهَلَّا pass.

Pa. ۷۶۸ مُهَمَّهٌ emaciavit, cfr. ar.
قَطَّ fuscus, subniger fuit ; it.
abscidit.

Ethpa. ۷۶۹ مُهَلَّا in cinerem re-
dactus est.

۷۷۰ مُهَمَّهٌ et ۷۷۱ مُهَمَّهٌ abscissio ; frag-
mentum.

۷۷۲ مُهَمَّهٌ sectio, segmentum.

۷۷۳ مُهَمَّهٌ , مُهَمَّهٌ cinis ; scoria ; cfr.
ar. قَطَّ pulvis. ۷۷۴ مُهَمَّهٌ
lixivium.

۷۷۵ مُهَمَّهٌ et ۷۷۶ مُهَمَّهٌ nebula.

۷۷۷ مُهَمَّهٌ et ۷۷۸ مُهَمَّهٌ cinereus.

۷۷۹ مُهَمَّهٌ , heb. נַפְרָא , fut. مُهَمَّهٌ ,

tenuis factus est; *trop.* debilis fuit; *cfr. ar.* قَنْ macie contabuit.

ስብሰራ subtilis.

الْمُكْتَبَرْتُونَ contractio.

مَلَأَهُمْ مَكَانِهِمْ *etc. xxix-xxxi, status; ordinatio, institutio.*

عَفْتُ verb. contract. a preceded.,
ordinavit.

ပါဝါစုနည်း အတတ်သော်၊ apparatus, præparatio.

A

قَطَمْ, ar. قَطَمْ, fut. قَطَمْهُ
abscidit, secuit, discerpsit;

abruptit rem; *intrans.*, deficit; *impers.*, **كَمْ** mihi

وَهُنَّ مُهْلِكُونَ actum est de re.

Part. act. et præs. ~~م~~,
م deficiens; *impers.*, deest.
Part. pass. ~~م~~,

Part. pass. et præt. مُنْهَىٰ ; castratus ; acerbissima res, in desperationem impellens.

Ethpe. **عَذَّلَ** pass.; **عَذَّلَهُ** **عَذَّلَهُ** ne desperet mens tua;

impers. ﻙ ﺃنْ ﻥَفِهُا لِ tædet
me hujus rei. ﻙ ﻥَفِهُا لِ

si animum desponeas. **مَعْذِلَة**
وَهُنَّ أَنْجَى مَعْذِلَةً! deficiunt ver-
 ba a sei Narratione.

Pa. ~~ت~~ concidit, penitus
secuit: *trāp*, tædio affecit

Seurat, v. 3 p. Medo - anect,

anxit, afflixit. *Part. pass.*
تَهْدِي, **تَهْدِي**; tædio affectus, socors.

Ethpa. **تَهْدِي** *pass.*; *impers.*,
ut Ethpe.

تَهْدِي cessatio; **تَهْدِي لَا**, sine intermissione.

تَهْدِي segmentum; particula.

تَهْدِي interruptio, cessatio.

تَهْدِي abscissio, resectio;
تَهْدِي **تَهْدِي** molestia, tædium
 animi; *it. abs.* animi dejectio,
 desperatio; **تَهْدِي لَا**, *sine*
tædio: strenue, constanter.

تَهْدِي baculus brevior.

تَهْدِي grex ovium, *ar.* قطيم.

تَهْدِي castratus.

تَهْدِي desperatio; ignavia.

تَهْدِي, *heb.* תַּהֲדִי, *ar.* قطف,
fut. تَهْدِي decerpsit fructum,
 collegit uvas, vindemiat; *trop.* obtinuit rem, lucratus
 est. *Part. pass.* **تَهْدِي**;
impers., تَهْدِي doluit.

Ethpe. **تَهْدِي** *pass.*; *it. dejecta*
 est anima, conturbata est;
it. impers., تَهْدِي *in angustiis fui*; dolui.

Pa. **تَهْدِي** carpsit fructum,
 decerpsit, collegit; *inde per extens.*, constrinxit; *trop.*
 cruciavit. *Part. pass.* **تَهْدِي**,

مَهْدِعًا; angustiatus, molestus, desperans.

Ethpa. **تَهْدِي** *pass.*; *impers.*,
ut in Ethpe.

مَهْدِعًا vindemia, messis; nomen stellæ Zodiaci; atriplex hortensis planta; blitum; *it. ut seq.*

تَهْدِي angor.

تَهْدِي vindemiator; *trop.* vexator.

تَهْدِي tædium, angor; defectio virium.

تَهْدِي, *ar.* قطينة, tegumentum; gausapa vestis (*gall. peluche*).

تَهْدِي, *emph.* **أَنْتَهْدِي** tegumentum.

تَهْدِي afflictus; vindemiatus.

تَهْدِي vindemiatio.

تَهْدِي et **تَهْدِي** κατάπλασμα, cataplasma; taenia vulneris.

تَهْدِي et **تَهْدِي** f., κατάρχασις, propositio affirmativa.

تَهْدِي مَهْدِعًا, c. **تَهْدِي** affirmavit; **تَهْدِي** مَهْدِعًا, καταφένει *id.*

تَهْدِي affirmative.

تَهْدِي affirmative.

تَهْدِي et **تَهْدِي** καταφένει, καταφένει, affirmativus.

نَفْعٌ, cfr. heb. **נָפָעַ**, fut. **نَفَعَ** ligavit, colligavit; texuit, contexuit, compegit, composuit. **نَفْعٌ نَفْعٌ** vel abs. **نَفْعٌ** texuit; composuit; trop. **أَنْجَلُ** **نَفْعٌ** *sibi luctum nexuit*: luxit; seq. **كَلَّا**, *alicui intulit luctum*; **أَنْجَلُ** **نَفْعٌ** insidias struxit.; **كَلَّا** **نَفْعٌ** coronam nexuit, trop. victor fuit; it. coronam nuptialem cinxit seu se matrimonio junxit; **أَنْجَلُ** **نَفْعٌ** *sibi invicem jurgia connexuerunt*; litigaverunt. **أَنْجَلُ**; **نَفْعٌ** secretum innexuit: consilium habuit cum aliquo, inde conspiravit; nnq. amicitiam contraxit. **نَفْعٌ**; **نَفْعٌ** choreas duxit. **أَنْجَلُ**; **نَفْعٌ** *sibi regalem coronam nexuit*; **نَفْعٌ** *apud Alchim.*, corpus volatile compegit; it. *intrans.*, compactus est, concrevit, coagulatus est; c. **و** *vel* **كَلَّا** oppressit, irruit turbo. Part. act. *præs.* **نَفْعٌ**, **أَنْجَلُ**, f. emph. **أَنْجَلُ**; subst. pars manus. Part. pass. et *præter*. **نَفْعٌ**, **أَنْجَلُ** opprimens, inde *adject.* violentus; subst. in emph., vis, necessitas; adverbial. **أَنْجَلُ** **نَفْعٌ** vi,

necessario; **نَفْعٌ** **نَفْعٌ** *vel* **نَفْعٌ** ex necessitate. Ethpe. **نَفْعَلِي** pass. Pa. **نَفْعٌ** ligavit, colligavit, complicavit; concrescere fecit. Ethpa. **نَفْعَلِي** colligatus est, coadunatus est. Aph. **نَفْعٌ** nexuit: concrescere fecit; ap. *Alchim.*, ut *Pe.* **نَفْعٌ** implicatio; colaphus. **أَنْجَلَمْ**, pl. **أَنْجَلَمْ** coagulum. **أَنْجَلَمْ** *id.*, al. inguen. **نَفْعٌ** nodus, vinculum; compago; trop. nodus magicus; ænigma; censura. **نَفْعٌ** *dimin.*, nodulus. **نَفْعٌ** vinculum; nodus. **نَفْعٌ**, **نَفْعٌ** colligatio, conjunctio; **نَفْعٌ** **نَفْعٌ** superciliorum contractio, *in signum iræ*. **نَفْعٌ**; **نَفْعٌ** *thalami structio*: nuptiae. ap. *Alchim.*, corporis fixatio; **نَفْعٌ**; **نَفْعٌ** cidaris; it. *inf. emph.* **نَفْعٌ** nodus: pons, ar. قَنْطَرَةً. **نَفْعٌ** **نَفْعٌ** gladii impactio: aggressio. **نَفْعٌ** vi; necessario. **أَنْجَلَمْ** concretio; necessitas. **أَنْجَلَمْ** vi agens: vi facta, imposita *vel* obtenta *res*; necessarius; pl. **أَنْجَلَمْ** necessitates.

مَهْرَبٌ	<i>et</i> مَهْرَبٌ violentus.
مَهْرَبٌ	vis, violentia.
مَهْرَبٌ	vis coactiva.
مَهْرَبٌ	excrecentia verrucosa <i>myrti</i> .
مَهْرَبٌ	conjunctio.
مَهْرَبٌ	colligans.
مَهْرَبٌ	compedes, ar. مَقْطَرَة ; it. coagulum.
مَهْرَبٌ	paxillus fixum retinens aratum, <i>cfr. neo-ar.</i> قَطْرِيْب .

مَهْرَبٌ, *a græco κατηγορεῖν*, accusavit ; prædicavit ; *apud logicos*, enuntiavit, significavit.

Ethpa. مَهْرَبٌ pass. ; it. assignatus est.

مَهْرَبٌ, مَهْرَبٌ, pl. مَهْرَبٌ, مَهْرَبٌ etc. f., κατηγορία, accusatio ; *apud logicos*, categoria, prædicamentum.

مَهْرَبٌ κατηγόρημα, prædicamentum.

مَهْرَبٌ κατηγορούμενος, id.

مَهْرَبٌ κατηγορικός, categoricus.

مَهْرَبٌ accusatio, lis ; prædictio, enuntiatio, significatio.

مَهْرَبٌ, مَهْرَبٌ *et* مَهْرَبٌ accusator.

مَهْرَبٌ	prædicatio <i>logica</i> , demonstratio.
مَهْرَبٌ	accusatio, lis ; pl. مَهْرَبٌ prædicamenta.
مَهْرَبٌ	accusator <i>ante tribunal</i> ; culpator ; <i>apud logicos</i> , prædicativus.
مَهْرَبٌ	accusatio, vituperium.
مَهْرَبٌ	accusatus, reus ; it. <i>apud logicos</i> , prædicabilis.
مَهْرَبٌ	categorice.
مَهْرَبٌ	<i>apud logicos</i> , prædictio.
مَهْرَبٌ	, ar. قَنْطَرَة , fornix, arcus.
مَهْرَبٌ	κίτριον, mali citræ fructus.
مَهْرَبٌ	καταρχή, principium.
مَهْرَبٌ	primarius.
مَهْرَبٌ	origo, antecedentia.
مَهْرَبٌ	, ar. قَطْرَان , oleum picinum, (<i>gall. goudron</i>).
مَهْرَبٌ	foculus thuribuli, thuribulum ; it. cypressus, <i>vel</i> abies.
مَهْرَبٌ	<i>et</i> مَهْرَبٌ, f., pharetra ; it. <i>et</i> مَهْرَبٌ amygdalus <i>arbor</i> .
مَهْرَبٌ	qui pharetras fabricat.
مَهْرَبٌ	stipulatio.
مَهْرَبٌ	<i>et nng</i> مَهْرَبٌ καταβράκτης , scala ; cata-

مَدْعُونٌ κατάθεσις, pl.
مَادِيْنَاتِيْسْتِيْسْ, testificatio ;
حَمْدَلَةً testificatus est.
مَدْعُونٌ κατάθεσθαι, c.
حَمْدَلَةً testificatus est, accusavit.

מְנֻהָּדָה funis, cfr. מְנֻהָּדָה f., et מְנֻהָּדָה f., κιβώτιον,
ciborium, conopeum, pixis in
qua servatur Sanctissimum
Sacramentum.

مُبِّرا, vox ar. قَانِدٌ, dux cohortis.
مُبِّهٌ وَمُهْمَهٌ etc. v. مُهْمَهٌ .
مُبِّأْسٌ, f., مُبِّأْسٌ , هَبْرٌ وَمُهْمَهٌ
 cedaris, mitra.

خَمْكَمٌ *κοιλία*, venter.
خَمْحَكْهَمٌ *κύμβαλον*, cymbalum.
خَمْ *κύων*, canis.
خَمْخَمَةً *κυνόμυια*, musca canina.

فِلِيس, **فِلِيْس**, **felis**, *ut* **فِلِيْس**; *it.*
فِلِيْس *et* **فَلِيْسِيْس** **نِسَرُوكَ**, *appe-*
titus insolitus prægnantium.

مَهْنَا, **مَهْنَمْ** et **مَهْنَمْ** aper.
مَهْنَمْ, v. **مَهْنَمْ**.
مَهْنَمْ κιγώνιον, cichorium
planta.

حُلّ *χοίλη*, cava.

قَلْيَة *vox lat., ar.*, cella.

مُكْرَهٌ latrina; cfr. κοῖλον.
مُكْرَهٌ، مُكْرَهٌ κίλων, equus
 admissarius.

سَمِّيَتْ semita.

مَكْلَمًا tumor seroti, hernia.
مَكْلَمَةً, **مَكْلَمَاتٍ** etc. *κειμήλιον*,
 thesaurus.

مَعْلَكْمٌ etc., κάμηλος, camelus; *it.* funis grossior.

ମୁଦ୍ରାକ୍ଷେତ୍ର , v. ପାତ୍ର ।

مُنْتَهٰ, *emph.* **مُنْتَهٰ**, *pl.* **مُنْتَهٰ**,
مُنْتَهٰ, *heb.* קָרְנָה, *cantus*, so-
 nus; *canticum*, *carmen*; to-
 nus; *metrum poeticum*; punc-
 tum. حَتَّى مُنْتَهٰ *cantavit*.

فَيْنٌ, *ar.* **فَيْنٌ**, faber spec. ferrarius.

فَتْنَة *verb. denom.*, fabrilem argumentum exercuit.

فَمِنْهُمْ ars fabri.
فَمِنْهُمْ مُّؤْمِنُونَ، مُّكَافِرٌ
f., etc., pl. مُّكَافِرٌ مُّكَافِرٌ
etc. κίνδυνος, periculum.

مِنْهُمْ	etc ; f.	مِنْهُمْ	ligneus.
كَلْبُهُمْ	periculum ;	لِحَاظَةٍ	pars lignea rei.
مِنْهُمْ	periclitatus est ; in	مِنْهُمْ	rigiditas, spasmus
	periculum conjecit.		corpus rigidum reddens.
مِنْهُمْ	periculosus.	مِنْهُ	f., κισσός, hedera.
مِنْهُمْ	κοινόν, cœtus, congrega-	مِنْهُمْ	et مِنْهُمْ κίσσηρις,
	tio ; it. communio.		pumex.
مِنْهُمْ	κοινωνία, participatio,	مِنْهُ	v. den., pumice fricavit
	communio.		seu acuit.
مِنْهُمْ	κήγηρος, vectigal.	مِنْهُمْ	κίσσα, merops avis ; it.
مِنْهُمْ	κίνη, ricinus, ut	مِنْهُ	v. مِنْهُ .
مِنْهُمْ	مِنْهُمْ .	مِنْهُمْ	κίστος, cistus.
		مِنْهُمْ	κίσθαρος, cistha-
			rus planta.
مِنْهُمْ	لِحَاظَةٍ, per extens.	مِنْهُمْ	κηφήν, κηφήνες,
	arbor ; Crux ; compedes ; nnq.		fucus apis, (gall. bourdon).
	manubrium, paxillus ; malus	مِنْهُمْ	etc. κηκίς,
	navis ; it. mensuræ seu pon-		galla (gall. noix de galle).
	deris species. مِنْهُمْ	مِنْهُ	merops avis, ar. قَيْقَى ; it.
	idolorum adoratio. مِنْهُمْ		κίνη, ut مِنْهُمْ ricinus com-
	lignum pini. مِنْهُمْ		munis.
	لِحَاظَةٍ مِنْهُمْ	مِنْهُمْ	الْمَدْخَلَةُ , مِنْهُمْ , v. s. مِنْ .
	lignum santali.	مِنْهُمْ	وَمِنْهُمْ et مِنْهُمْ vomer aratri.
مِنْ	verb. denom., aliquid e		
	ligno fabricavit.		
Ethpa. مِنْهُمْ	ut lignum ri-	مِنْ	كύριος, dominus ; f. مِنْ
	guit.	مِنْهُمْ	et مِنْهُمْ domina.
مِنْهُمْ	rigiditas.	مِنْ	ar. قَيْد, pix.
مِنْهُمْ	dim., lignum parvum,	Pa. مِنْ	v. denom., pice obdu-
	assula, ramulus ; stipula.		xit.
مِنْهُمْ	per modum ligni.	مِنْ	الْفَلَجُولُ مِنْهُمْ
			flagellum e pilis pice ob-
			ductis confectum.
		مِنْهُمْ	الْبَرْسُونَ مِنْهُمْ buccinum, con-
			cha marina.

مَهْرَبٌ مَهْرَبٌ κηρός, cera.	مَدْتَهْرٌ مَدْتَهْرٌ κηρωτός, candela cerea.	مَدْتَهْرٌ مَدْتَهْرٌ κηρός, favus mellis.	مَدْتَهْرٌ مَدْتَهْرٌ κηρός, varix.	مَدْتَهْرٌ مَدْتَهْرٌ κηροκία, circæa planta.	مَدْتَهْرٌ مَدْتَهْرٌ κηροβε, planta, poterion spinosum.	مَهْرَبٌ مَهْرَبٌ m., κηρύξ, cithara.	مَهْرَبٌ مَهْرَبٌ et مَهْرَبٌ مَهْرَبٌ citharæus, ad citharam pertinens.	مَهْرَبٌ مَهْرَبٌ v. denom., cithara pulsavit.	مَهْرَبٌ مَهْرَبٌ id.	مَهْرَبٌ مَهْرَبٌ et مَهْرَبٌ مَهْرَبٌ citharœdus, citharista ; f. مَهْرَبٌ مَهْرَبٌ .	مَهْرَبٌ مَهْرَبٌ citharista.	مَهْرَبٌ مَهْرَبٌ dim. ; parva cithara.	مَهْرَبٌ مَهْرَبٌ ars citharizandi.	مَهْرَبٌ مَهْرَبٌ κάχρυς, cachrys plan ta, libanotis ; panicum.	مَهْرَبٌ مَهْرَبٌ , v. s. مَهْرَبٌ .	مَهْرَبٌ مَهْرَبٌ , heb. הַלְּקָה , ar. قَلَّا , fut. مَهْرَبٌ frixit in sartagine ; tor ruit, cruciavit ; trop. percus sit, discerpsit, cfr. ar. قَلَّا odio habuit Part. pass. مَهْرَبٌ مَهْرَبٌ سُمًا مَهْرَبٌ ; مَهْرَبٌ aes adustum ;	مَدْتَهْرٌ مَدْتَهْرٌ subst. in pl. f. emph. triticum frixum, polenta.	مَهْرَبٌ مَهْرَبٌ Ethpe. امْكَأْنِي pass. ; it. contemptus est, cfr. مَهْرَبٌ .	مَهْرَبٌ مَهْرَبٌ Pa. مَهْرَبٌ frixit ; trop. vexavit, turbavit ; rixatus est.	مَهْرَبٌ مَهْرَبٌ Ethpa. امْكَأْنِي pass.	مَهْرَبٌ مَهْرَبٌ Aph. امْكَأْنِي frixit ; sprevit, c. acc. vel مَهْرَبٌ ; parvi fecit, op petiit mortem, periculum, c. مَهْرَبٌ ; intrans., protervus fuit, cfr. مَهْرَبٌ . مَهْرَبٌ مَهْرَبٌ حُوْجَنْيُ . مَهْرَبٌ مَهْرَبٌ وَعْلَمْ لَهْلَهْ نَهْمَهْ ne sinas appetitum animæ tuæ h. e. rationi repugnare. Part. pass. مَهْرَبٌ مَهْرَبٌ emph. et subst. مَهْرَبٌ مَهْرَبٌ ar. مَهْرَبٌ , sartago, frixorium.	مَهْرَبٌ مَهْرَبٌ مَهْرَبٌ frictio ; contusio, flagellatio ; pleuritis ; it. ut seq.	مَهْرَبٌ مَهْرَبٌ , pl. مَهْرَبٌ مَهْرَبٌ contemptus, contumelia, irrisio.	مَهْرَبٌ مَهْرَبٌ turatio ; contumelia.	مَهْرَبٌ مَهْرَبٌ , ar. قَلَّا , alcali vegetabile.	مَهْرَبٌ مَهْرَبٌ et مَهْرَبٌ , v. s. مَهْرَبٌ .	مَهْرَبٌ مَهْرَبٌ , corrupt. e lat., sæcularis. امْهَلْمَهْ مَهْرَبٌ sæculare certamen.	مَهْرَبٌ مَهْرَبٌ vox ar. مَهْرَبٌ مَهْرَبٌ , forma, matrix, modulus.	مَهْرَبٌ مَهْرَبٌ قَلَّبٌ , ar. مَهْرَبٌ مَهْرَبٌ armilla ; it. ut مَهْرَبٌ مَهْرَبٌ .
--------------------------------	---	--	-------------------------------------	---	--	---------------------------------------	--	--	-----------------------	--	-------------------------------	---	-------------------------------------	---	--------------------------------------	--	--	---	--	---	---	--	--	---	---	--	---	---	--

- مَكْهُومَةٌ**, *heb.* כָּלֹבֶת, *cavea, cfr.* κλωθός; *it.* sporta.
مَكْهُومَةٌ *cavearum, vel sportarum confector.*
- مَكْهُومَةٌ** et مَكْهُومَةٌ, مَكْهُومَةٌ *sine mani-*
cis; *casula sacerdotalis.*
- مَكْهُومَةٌ** *vestis sordida.*
- مَكْهُومَةٌ** *e lat. corrupt., cervical.*
- مَكْهُومَةٌ** et مَكْهُومَةٌ *opera-*
rius; cfr. pers. گلیکر, cæ-
mentarius.
- مَكْهُومَةٌ**, *ar. قَلَادَةٌ*, *monile, annu-*
lus, capistrum quo ducitur
camelus.
- مَكْهُومَةٌ** *junctura; pessulus.*
- مَكْهُومَةٌ**, *it. مَكْهُومَةٌ* κλεῖς, κλεῖδα,
ar. إِقْبَيْد, clavis; it. jugulus
(gall. clavicle).
- مَكْهُومَةٌ** *claviger.*
- مَكْهُومَةٌ** *repagulum.*
- مَكْهُومَةٌ** κύλινδρος, *cylindrus.*
- مَكْهُومَةٌ** κλήμα, *ramulus.*
- مَكْهُومَةٌ** et مَكْهُومَةٌ *gluma, seu*
pelliculum fructuum.
- مَكْهُومَةٌ**, *neō-ar. قَلْرَز*, *annulus seu*
pessulus januæ.
- مَكْهُومَةٌ** *culter.*
- مَكْهُومَةٌ** γαλινάριον, *frænum ele-*
phantis.
- مَكْهُومَةٌ** καλός, *bonus, pulcher.*
- مَكْهُومَةٌ** κολλύρα, *placenta.*

- مَكْهُومَةٌ**, *pl. placentula.*
- مَكْهُومَةٌ** *v. denom., placentas confe-*
cit.
- مَكْهُومَةٌ** lignum santali.
- مَكْهُومَةٌ**, *fut. قَلَّتْ*,
secuit, disseccuit.
- مَكْهُومَةٌ** et مَكْهُومَةٌ *ferula com-*
munis planta.
- مَكْهُومَةٌ**, *inus., cfr. heb. כָּלַח,*
contraxit, *et ar. قَلَصْ se con-*
traxit.
- Pa. مَكْهُومَةٌ** *objurgavit.*
- Ethpa. مَكْهُومَةٌ** *parcus, avarus*
fuit.
- مَكْهُومَةٌ** مَكْهُومَةٌ *avarus.*
- مَكْهُومَةٌ** مَكْهُومَةٌ *avaritia.*
- مَكْهُومَةٌ** مَكْهُومَةٌ *sordidus.*
- مَكْهُومَةٌ**, *v. s. مَلَأْ*.
- مَكْهُومَةٌ** et مَكْهُومَةٌ *etc.,*
κλίβανος, *clibanus.*
- مَكْهُومَةٌ** *lat., caliga, calceamentorum species.*
- مَكْهُومَةٌ** *caligarum confector.*
- مَكْهُومَةٌ**, *v. s. مَلَأْ .*
- مَكْهُومَةٌ** *etc., κλίτος, clivus.*
- مَكْهُومَةٌ**, *pl. مَكْهُومَةٌ* et مَكْهُومَةٌ *clima, regio, provin-*
cia.
- مَكْهُومَةٌ** κλήματις, *clematis herba.*
- مَكْهُومَةٌ**, *v. مَكْهُومَةٌ .*

مَكْنُونٌ et **حَلَامِنْهُ** καλάνιος , elec-
trum.

مَكْتُوبٌ *xλένη*, lectus.

مَكْنُهْفُهُ وَمُ κλινοπόδιον, clino-podium herba.

مَكْهُوْذًا κλεισώρεια, clausura,
arx munita, fauces montis.

مَكْفُوسٌ, f., ἐκκλησία, ecclesia;
مَكْفُوسٌ أَنْتِي مَفْتُوحٌ ἐκδικητής
 ecclesiæ advocati.

مَكْتُوبًا etc., pro مَكْتُوبًا مَكْتُوبًا ecclesiastica historia, absol.
vel c. مَكْتُوبًا.

مَكْنَهٌ *κληρος*, sors, portio; clerus. cœtus clericorum.

مَكْتُومٌ, **مَكْتُومُونَ**, **مَكْتُومَاتٍ**, clericus, pl. **مَكْتُومٌ**, **مَكْتُومَاتٍ**, **مَكْتُومَاتٍ** et **مَكْتُومَاتٍ**.

مَكْتَبَةٌ clericatus, ordo
clericorum.

﴿ مَنْهُ ﴾, heb. מָנַח, ar. قَلَّ, fut.
 «**نَفِعٌ**» *levis fuit vel factus est;*
decrevit, imminutus est; celer fuit, seq. **مُنْقَدِرٌ** *comparat.*
velocior fuit. **مَكْبُرٌ** *allevati sunt*
omnes dolores mei.

Pa. **لَهُ** allevavit; leviorem, faciliorem reddidit *rem*; minoris aestimavit. *Part. pass.* **لَهُكَمْ**, **مَهْلَلاً**; *adject.* levis, celer.

Aph.  leviorem efficit,
imminuit; levavit, e medio tu-
lit, amovit; acceleravit; inde
superavit; *c.*  *pers.*, mino-
ris fecit, contempsit.

Palp. مَكْفُون levem reddidit,
moveri fecit, detorsit; *trop.*
leviter tractavit, irrigui tra-
didit, perturbavit, *ar.* قَائِق.

Ethpalp. مَدْلِي pass.

مُكْلَلاً contemptus, ignominia.

فِعْلًا *velocitas; allevatio.*

مَكْهُولٌ levis, celer; strabo.

مَكْمَلًا *velocitas; strabis-*
mus.

مَكْلُوماً, **مَكْلُوماً** *levis, non ponderosus, inde parvus, exiguus, agilis, velox, promptus; trop. leviter agens, temerarius;* **مَهْلِكًا**, **مَهْلِكًا** *celeris seu*

prompta mors ex ictu gladii ;
 هَلْمَهْلًا مَكْلَهْلًا أَمْ زُحْنَهْلًا
 juventus præceps est ad lo-
 quendum prout ipsi placet ;
 in statu absol. ponitur cum
 omni genere vel numero sicut
 adverbium : paucus, pauci,
 paucæ, pauca ; parum, pau-
 latim. هَلْمَهْلًا مَكْلَهْلًا
 vel

كَمْ حِلَّ pauci dies. مَدِي

«مَكْ» parvum quid consola-
tionis. «مَكْ» هَذِهِ hæc
pauca verba. «مَكْ» هَذِهِ وَسْتَ

quidam ex rusticis ; c. مَهْمَهْ comp., celerior. مَهْمَهْ مَهْمَهْ et مَهْمَهْ مَهْمَهْ paululum ; paulatim ; حَمْمَهْ مَهْمَهْ ex parte ; it. adverb. temporis : brevi, inde paulisper, parumper. حَمْمَهْ مَهْمَهْ id. ; quamprimum. حَمْمَهْ مَهْمَهْ saepius. حَمْمَهْ مَهْمَهْ vel absol. حَمْمَهْ مَهْمَهْ paulo post ; حَمْمَهْ مَهْمَهْ et مَهْمَهْ مَهْمَهْ paulo ante, حَمْمَهْ مَهْمَهْ fere, pæne ; parumper.

مَهْمَهْ in brevi, celeriter ; facile.

مَهْمَهْ levitas ; velocitas.

مَهْمَهْ contumelia.

مَهْمَهْ et مَهْمَهْ , contr. ex inus. مَهْمَهْ , pl. مَهْمَهْ , sterquilinium.

مَهْمَهْ leviter.

مَهْمَهْ allevatio ; velocitas.

مَهْمَهْ objurgatio.

مَهْمَهْ mimosa arbor.

مَهْمَهْ حُلْلَهْ , glutinum.

مَهْمَهْ , emph. مَهْمَهْ et مَهْمَهْ حُلْلَهْ , f., pl. مَهْمَهْ , مَهْمَهْ , calathus, corbis ; it. καρπή , ruptura.

مَهْمَهْ unius testiculi vir.

مَهْمَهْ , pl. مَهْمَهْ , emph. مَهْمَهْ , pl. مَهْمَهْ , denom., laudibus extulit ; appellavit ad. Part.

مَهْمَهْ dim. præc.

مَهْمَهْ , emph. مَهْمَهْ , pl. مَهْمَهْ حُلْلَهْ , οὐέλλαχ , οὐέλλιον , ar. قَلَّيَةٌ , cella ; cellula. حَتْتَسْ مَهْمَهْ syncelli, assessori Episcopi.

مَهْمَهْ dim. cellula.

مَهْمَهْ , pl. مَهْمَهْ مَهْمَهْ cellarius, cellas ministrans.

مَهْمَهْ , pler. f., ar. قَمَةٌ , pediculus.

مَهْمَهْ pediculi seu vermes frugum.

مَهْمَهْ οὐάλαχμος , calamus.

مَهْمَهْ οὐάλαχμάριον , calamaria theca.

مَهْمَهْ et مَهْمَهْ , ar. إِقْلِيمَيْهَ , ut مَهْمَهْ مَهْمَهْ cadmia (gall. calamine).

مَهْمَهْ ricinus communis.

مَهْمَهْ , v. s. rad. مَهْمَهْ .

مَهْمَهْ id. q. مَهْمَهْ ἀγγύλιον , armilla.

مَهْمَهْ , pl. مَهْمَهْ etc. lat., calendæ, initium mensis vel anni.

مَهْمَهْ janua, postes.

مَهْمَهْ , مَهْمَهْ οὐάλεος , laus, encomium.

Pa. مَهْمَهْ v. denom., laudibus extulit ; appellavit ad. Part.

pass. مدْلَهْا , مدْكَهْ ; *adj.* laudabilis.

Ethpa. مدْكَهْ اِي laudatus est. مدْلَهْ scutica, *ar.* قنس funis. مدْكَهْ et مدْكَهْ laudabiliter.

مدْكَهْ laudator, laudatorius ; nomen accentus.

مدْكَهْ مدْلَهْ laudabilis, dignus laude.

مدْكَهْ مدْكَهْ laudabiliter.

مدْكَهْ et مدْلَهْ , heb.

كُلُّ , *ar.* مِقْلَاء , funda ; *it.* velum navis, *ar.* قنم. مدْلَهْ pl. مدْكَهْ مدْلَهْ ballista.

fundæ oris : pronunciationis instrumenta *ut os, dentes, etc.*

Pa. مدْ v. *denom.*, funda projectit.

مدْكَهْ , *ar.* فُلَاء , globulus fundæ, ipsa funda ; novalia ; *it.* lutum, gleba ; *ap. Alchim.* metallum commixtum.

مدْكَهْ jaculator, funditor.

مدْكَهْ , *ar.* مِقْلَاء , funda.

مدْكَهْ ballista.

مدْكَهْ et melius مدْكَهْ , vox *ar.* قَنْعَة , arx.

مدْكَهْ , fut. مدْكَهْ , *ar.* قَنَّت , decorticavit ; denudavit, abrasit.

Ethpe. اِي مدْكَهْ pass.

Pa. مدْكَهْ ut *Peal.*

Ethpa. اِي مدْكَهْ abrasus est.

مدْكَهْ , pl. مدْكَهْ , emph. مدْكَهْ , pl. cortex arboris, ovi ; putamen fructus ; squama piscis, oculi ; lamina. مدْكَهْ وَسْفَا scoria ferrari. مدْكَهْ وَسْفَا , *ar.* cortex caryophylli, cinnamomum.

مدْكَهْ cortice præditus ; squamatus.

مدْكَهْ ; *it.* مِدْكَهْ folium libri.

مدْكَهْ scabies ; *cfr. ar.* كَنْت pustulæ.

مدْكَهْ cortex, folium.

مدْكَهْ decorticator ; trop. verba limans.

مدْكَهْ κολοφωνία , resina.

مدْكَهْ κύλπος , circulus annorum.

مدْكَهْ υρτεός , urceus, vas.

مدْكَهْ σκολόπενδρα , scolopendra, millepes.

مدْكَهْ ἔκλειψις , eclipse.

مدْكَهْ , fut. مدْكَهْ torvo oculo aspergit ; querelas movit.

مدْكَهْ strabo.

مدْكَهْ مدْكَهْ strabismus.

مدْكَهْ κάγλη , glareæ, calculus.

مَدَّا قَنَّاسٌ , ar. مَدَّا مَدَّا , colocasia planta.

مَدَّيْهُ فُلْمَيْهُ , melius γαλαξίτης , chalcitis, vitriolum album.

مَدَّهُ γαράκωρα , chald. נָרִיר , pl. مَدَّهُ مَدَّهُ vallum, agger ; munimentum.

مَدَّعُ calx. مَدَّعٌ γαλνεύς , faber aerarius.

مَدَّعٌ , v. s. مَدَّعٌ . مَدَّعٌ olus tenuis.

مَدَّعٌ nitrum friabile.

مَدَّعٌ et مَدَّعٌ γάληνονθον , vitriolum viride.

مَدَّعَتَهُ monstra, visiones, spectra.

مَدَّعَتَهُ , pers. كَمَاشِيرٍ , gummi indicum, opopanax.

مَدَّعَتَهُ , ar. قَنْيَلٌ , terra rubra. مَدَّعٌ pulsavit tintinnabulum.

مَدَّعَتَهُ pulsatio tintinnabuli.

مَدَّعَتَهُ neol. græc. κολλάριον , collare.

مَدَّعَتَهُ neo-gr. κελλαρίτης , cellarius, cfr. مَدَّعٌ .

مَدَّعٌ et Aph. مَدَّعٌ fluctus exagitavit.

مَدَّعٌ aedes Catholici.

مَدَّعٌ v. s. مَدَّعٌ .

مَدَّا limax.

مَدَّهُ et مَدَّهُ gumimi arabicum , v. مَدَّهُ .

مَدَّهُ , heb. קְמַחַ , ar. كَمْحَةٌ farina ; مَدَّهُ farina triticea.

مَدَّهُ مَدَّهُ farina hordeacea. مَدَّهُ cicer.

مَدَّهُ مَعْرُورٌ mucor, corruptio.

مَدَّهُ , heb. קְנַתַּה , ar. كَنْتَهٌ fut. نَعْدَدَهُ strinxit, con-

strinxit ; apprehendit.

Ethpe. هَمْفَلٌ pass. ; it. corrugatus est.

Pa. هَمْدَهُ corrugavit.

Ethpa. هَمْفَلٌ pass.

Parel هَمْفَلٌ frontem corrugavit, vultum severe contraxit.

أَغْدَهُ , pl. أَغْدَهُ مَعْتَهُ ligamen ; spec. fasciae infantis, ar. قَمَاطٌ .

أَغْدَهُ ruga. مَهْمَدَهُ contrahens manum h. e. avarus.

أَغْدَهُ corrugatus ; contractus, curvatus ; subst. incunabula ; it. comes, cfr. مَهْمَسٌ .

أَغْدَهُ corrugatio frontis, contractio vultus.

أَغْدَهُ نَامِرَةٌ , capsula.

أَغْدَهُ , chald. كَمِرَنْ , نَامِرِنْ , caminus, foculus.

مُهَمَّدًا, pl. **مُهَمَّدَاتٍ** ar. تَوِيسْ , camisia, ut مُهَمَّدًا .

مُهَمَّد, fut. مُهَمَّدٌ mucidus factus est panis ; putruit. Part. præs. مُهَلْلٌ ; subst. mucor, sordes.

Pa. مُهَمَّد putruit.

Aph. مُهَلْلٌ mucorem contraxit panis ; corruptæ sunt species eucharisticæ.

مُهَلْلٌ et مُهَمَّدَاتٍ mucor, corruptio.

مُهَلْلٌ mucor ; it. ut seq.

مُهَمَّدَاتٍ, pl. مُهَمَّدَاتٍ placenta.

مُهَلْلٌ etc. مُهَلْلٌ res pretiosæ, thesaurus.

مُهَمَّدَاتٍ neolog. gr. καμελάκιον , pileus, tiara, pileus e juncis contextus, pl. مُهَمَّدَاتٍ .

مُهَمَّدَاتٍ camo constrinxit, v. denom. a مُهَمَّدَاتٍ q. v.

مُهَمَّدَاتٍ , ar. قَمَامَة , quisquiliae, purgamentum.

مُهَمَّدَاتٍ , consult, usit. in part. مُهَمَّدَاتٍ . Part. pass. مُهَمَّدَاتٍ consutus ; inde spec. in pl. مُهَمَّدَاتٍ amuletum

مُهَمَّدَاتٍ neolog. gr. καμπάγιον , calceamenta.

مُهَمَّدَاتٍ lat., campus.

مُهَمَّدَاتٍ et مُهَمَّدَاتٍ καμπάγιος , meta.

مُهَمَّدَاتٍ , ar. قَمَصْ , locusta ; it. pastinaca agrestis planta.

مُهَمَّدَاتٍ , v. مُهَمَّدَاتٍ .

مُهَمَّدَاتٍ et مُهَمَّدَاتٍ neo-ar. مُهَمَّدَاتٍ , it. مُهَمَّدَاتٍ zona ; ligamen ; مُهَمَّدَاتٍ زُوْدِيُوسْ Zodiacus.

مُهَمَّدَاتٍ ligamen.

مُهَمَّدَاتٍ هَنْتَلٌ , etc., deriv. a مُهَمَّدَاتٍ q. v.

مُهَمَّدَاتٍ, heb. קָנָה , ar. قَنَى , fut.

مُهَمَّدَاتٍ acquisivit, possedit ; accepit, habuit, nactus est bonum vel malum. مُهَمَّدَاتٍ consensum assecuti sunt : sibi consenserunt. مُهَمَّدَاتٍ perfectionem obtinuit res.

Part. act. مُهَمَّدَاتٍ , emph. et subst.

مُهَمَّدَاتٍ possessor. Part. pass. active usurpat. مُهَمَّدَاتٍ , acquiescens, possidens ; pl.

مُهَمَّدَاتٍ , emph. مُهَمَّدَاتٍ . مُهَمَّدَاتٍ . مُهَمَّدَاتٍ omnia possidens :

Omnipotens. بُوَّبَ مُهَمَّدَاتٍ mente prædicti.

Ethpe. مُهَمَّدَاتٍ pass.

Pa. مُهَمَّدَاتٍ possedit, sibi servavit.

Aph. مُهَمَّدَاتٍ possidere, acquirere fecit ; impertitus est, cessit, c. acc. et مُهَمَّدَاتٍ , vel c. dupl. ac-

cus. هُنْدٌ فَعْلَمٌ auctoritatem dedit *rei*, persuasionem indit *alicui*. نَحْمَتْ سَتْ لَا مَهْمَنْ opes vitam seu salutem aeternam *nobis* non afferunt.

Part. act. مَهْمَنْ ; مَهْمَنْ اَسْمَهْ مَهْمَنْهُ فَعْلَمْ argumen-ta persuasionem afferentia seu persuasoria.

فَعْلَمْ , pl. فَعْلَمَاتْ , فَعْلَمْ posses-sio; opes, bona, spec. mobilia; pecora; animalia domestica; jumenta; servi. فَعْلَمَاتْ فَعْلَمَاتْ bona ecclesiastica.

فَعْلَمَاتْ secundum habitum, ex more.

فَعْلَمْ , pl. فَعْلَمَاتْ , emph. فَعْلَمْ , heb. كَنَّةٌ , ar. قَنَّةٌ , canna, calamus; stipula, cul-mus; calamus *scriptorius*, stylus; calamus *mensorius*; junctura *brachii* ; فَعْلَمْ

اَلْوَحْدَةِ وَالْوَكْرَةِ et abs. فَعْلَمْ virga virilis. فَعْلَمْ فَعْلَمْ fistula gut-turis. فَعْلَمْ مَهْمَنْ Libra, signum Zodiaci.

فَعْلَمْ possessor.

فَعْلَمْ id.; adj. ap. gramm., pos-sessivum *nomen*,

فَعْلَمْ possessio, opes, bona; id quod acquiritur, *inde* habitus.

فَعْلَمْ , pl. فَعْلَمَاتْ turma; it. in pl. et فَعْلَمَاتْ imagines, idola

præs. feminina, cfr. heb. קָנָה .

فَعْلَمْ calamo similis.

فَعْلَمْهُ acquisitio.

فَعْلَمْ largitor.

فَعْلَمَهُ quod acquiri potest; ci-curable *animal*.

فَعْلَمَهُ possessio.

اَلْمَنْ livor; trop. zelus, odium, heb. קָנָה zelus ardens.

فَعْلَمْهُ giraffa; it. cynara herba.

فَعْلَمْ - Pa. فَعْلَمْ insidiatus est; cfr. ar. قَتَّابُ hostes turmatim aggredi.

Aph. اَهْمَنْ ad prædandum ivit. فَعْلَمْ prædator, insidiator; it. insidiae; cfr. ar. مَقْتَلٌ , turma equitum.

فَعْلَمْ funarius, cfr. مَهْمَنْهُ .

فَعْلَمْ مَهْمَنْ مَهْمَنْ οὐνάρχαρι, minium.

فَعْلَمْ مَهْمَنْ qui accedit ignem in balneis.

فَعْلَمْ saponaria officinalis herba.

فَعْلَمْ v. s. مَهْمَنْ ; it. et κοντάκιον , volumen, liber; missale seu liber liturgicus missæ.

فَعْلَمْ مَهْمَنْ c., pl. فَعْلَمَاتْ vox lat., ar. قَنْدِيلٌ , candela, luminare, candelabrum.

λυκάνθρωπος, ar. قَطْرُبُ, labo-
rants cynanthropia vel lycan-
thropia, morbo scil. quo putat
æger se mutatum in canem
vel lupum.

هَنْدَبٌ *f.*, κυνίδη, urtica.

نَمْرُونْ وَ نَمْرُونْ Cnidium oleum.

فَلِمَّا , v. s.

κηλεύσις κηλεύσις, pruritus.

etc. κυπήκος,
carthamus *planta*.

مَنْتَ, *pl.* **مَنْتَ**, *et مَنْتَ* *xóyyη*, *pl.* **مَنْتَ**,
concha, absis ecclesiae seu al-
taris; altare. **مَنْتَ** *id.*

مَهْبِطًا, **مَهْبِطًا** et **aedituus**,
qui curam habet ecclesiæ, *vel*
altaris; ostiarius **ecclesice**.

מְחַמֵּד κορύβηιον, murex tyrius.
סְגִירָה gemma.

منكّ *lat.*, canalis, via.

مَنْهَا, pl. **مَنْهَمَا**, **مَنْهَمَةً**.

ar. أَقْثَوْم, hypostasis, substantia, ens in se subsistens;

existencia, res existens, rei
natura; persona, individuum;

Personæ divinæ *Sanctissimæ*
Trinitatis ^{litterarum} _{realis}

tas; c. pron. possess. reflexivum sensum habet:

ego ipsemet, هُنَّا مُبْ tumetip-
se, وَهُنَّا مُ vel emphat.

ipsimet, *vel* ut seipsum regem constituat; meus proprius sanguis. *adverb.* sibi metipsi loquebatur. *adverb.* domus contra se divisa; *adverb.* et usitat. *adverb.* in propria persona; per se ipsum; in se, reipsa.

Ethpa. ئەمەل v. denom., hypostasis, persona factus est.

مَنْهُ مَأْمَنٌ personaliter; in se;
in propria persona.

هَنْدُ مُحَمَّدٌ hypostaticus, personalis; primogenius; realis, proprius; gramm., personale nomen.

|La^كم^ه م^ه و et |La^كم^ه م^ه و personali-
tas.

مُنْهَدِرٌ subsistens, persona-
lis

cinnamomum, ut **cinnamomum**.

ن هد *nidus*; *arvearius*; *cfr.*
heb. נִידָה, *ar.* كَنْnidus, *et al.*
neo-ar. قَنْaviarium (*gall. poulailler*).

Aph. *¶l v. denom.*, nidificavit;
sedem fixit.

فَنْدِلٌ, ar. قَنْدِيلَة, ampulla vitrea.
هُنْدٌ, emph. هُنْدٌ, nucleus.

هَنْتَا *id.*; *cicer*; *it.* tributum,
cfr. هَنْهُرَا.

هَنْمُمَا *ut* هَنْسُمَا.

هَلْلَا, *fut.* هَنْدُنْ, cæruleus
fuit, lividus fuit; *cfr.* هَلْلَهَا *s.*
هَنْنَا.

هَنْتَا, هَنْنَا cæruleus, lividus,
cfr. هَنْنَا; *it.* *ut seq.*

هَنْتَا, هَنْدَا isatis *planta*; velum
capitis mulierum, *ar.* قناع
pallium.

هَنْدَ *v. denom.*, pallio induit.

هَمْنَتَا colore cæruleo tingens.

هَمْنَهَا vestis, *spec.* velum
muliebre.

هَمْنَتَا color cæruleus; isatis
planta.

هَنْفَا *et* هَنْفَا cannabis, *ar.* قنب.

هَنْوُ vox lat., consul, *ar.* قاضٌ.
هَنْلَا et هَنْلَا, vox lat., unde
neolog. gr. κάγκελλος, can-
celli.

هَنْكُنَا οὐρανολάριος, cancel-
larius.

هَنْمُ *v. denom.* a هَنْدَا melodya,
cecinit; harmonice dispositus.

Ethpalp. هَنْلَهَا *pass.*

هَنْهُنَا concentus musicus.

هَنْهُنَا, هَنْهُنَا οχήνη, fontes.

هَنْلَهَا Libra, signum Zodiaci,
contr. a هَنْهُنَا statera *et* هَنْهُنَا
perfecta.

هَنْدَا وَبِهَا et هَنْدَا وَبِهَا
δες, cantharides, scarabei.

هَنْهُهَهَا, *pl.* هَنْهُهَهَا spasmus,
convulsio, membrorum rigiditas,
cfr. هَنْهُهَهَا, *it.* هَنْهُهَهَا *et*
ar. قَرَّriguit.

هَنْهَأْنَا nux pinea.

هَنْهُهَهَا callum; callosus, *cfr.*
ar. قَرْبَهُ, durus fuit.

هَنْهَهَهَا callositas.

هَنْهَهَا et هَنْهَهَا cassis, galea;
trop. هَنْهَهَا وَهَنْهَهَا cœlorum
tegmen.

هَنْهَهَا, هَنْهَهَا scabie laborans;
calvus.

هَنْهَهَا scabies.

هَنْهَهَا ουρανίτερος, *ar.* قصدير,
stannum.

هَنْهَهَا f., ζέστης, *ar.* نقط, *pl.*
هَنْهَهَا sextarius liquidorum
mensura vas, urceus.

هَنْهَهَا vox lat., quæstionarius,
carnifex; satelles.

هَنْهَهَا officium carnificis.
هَنْهَهَا, v. هَنْهَهَا هَنْهَهَا.

هَنْهَهَا οάστωρ, castor animal;
it. *et* هَنْهَهَا lat., quæstor.

هَنْهَهَا lat., castellum.

هَنْهَهَا οαστανέα, nux castanea.

هَنْهَهَا, *ar.* قسطار, argenta-
rius.

لَاتِفَهُ *lat.*, castra munita, arx; *pl.* **لَاتِفَهُنَّ**.

لَاتِفَهُنَّ *κατάστρωμα*, tabulum; vestibulum, *per extens.*, templum; gradus *altaris*, cancelli; pars templi cancellis separata.

لَاتِفَهُنَّ, **لَاتِفَهُنَّهُ** etc. *κέστρον*, betonica *planta* (*gall.* bétoine); *it.* *ut لَاتِفَهُنَّ*.

لَاتِفَهُنَّ, **لَاتِفَهُنَّهُ** etc. *lat.*, castrensis, minister palatinus (*gall.* intendant); *it.* (*lat.* castratus), princeps eunuchorum.

لَاتِفَهُنَّ *κασία*, casia.

لَاتِفَهُنَّ *vox lat.*, casula sacerdotalis (*gall.* chasuble); vestis pontificia.

لَاتِفَهُنَّ, **لَاتِفَهُنَّهُ** *et لَاتِفَهُنَّ* *κόσμος*, decus, ordo universi, *inde mundus ipse*.

لَاتِفَهُنَّ *v. denom.*, decoravit, ornavit. *Part. pass.* **لَاتِفَهُنَّ**; **لَاتِفَهُنَّ**.

Ethpalp. **لَاتِفَهُنَّا** *pass.*

لَاتِفَهُنَّ *κόσμησις*, ornatus.

لَاتِفَهُنَّ *κόσμητική*, mundi historia.

لَاتِفَهُنَّ *decoratio, exornatio*.

لَاتِفَهُنَّ *κοσμοκράτωρ*, princeps mundi.

لَاتِفَهُنَّ; *it.* **لَاتِفَهُنَّ**, *Cæsar*; *unde cæsar, imperator*, *ar.* **قَيْصَرٌ**; *pl.* **لَاتِفَهُنَّ**, **لَاتِفَهُنَّهُ** etc.; **لَاتِفَهُنَّ** *الْأَرْجَنْتِينُ* regale.

لَاتِفَهُنَّ *et لَاتِفَهُنَّ*, *v.* **لَاتِفَهُنَّ**.

لَاتِفَهُنَّ, *ar.* **قَوْصَرَةٌ**, *vas, olla parva*.

لَاتِفَهُنَّ, *cfr.* **لَاتِفَهُنَّ**, *fut.* **لَاتِفَهُنَّ**, clamavit; sonum edidit. **لَاتِفَهُنَّ** *لَاتِفَهُنَّ* *ad Cæsarem appellavit*. **لَاتِفَهُنَّ** *الْأَرْجَنْتِينُ* proclamavit nomen *regis*. *Part. act.* **لَاتِفَهُنَّ**, **لَاتِفَهُنَّ** *contr. ex لَاتِفَهُنَّ*; **لَاتِفَهُنَّ**.

Ethpe. **لَاتِفَهُنَّا** acclamatus est.

Pa. **لَاتِفَهُنَّ** exclamavit, vociferavit; maledixit.

Aph. **لَاتِفَهُنَّ** clamare fecit, clamores excitavit.

لَاتِفَهُنَّ *f., pl.* **لَاتِفَهُنَّ**, clamor, clangor; acclamatio, plausus.

لَاتِفَهُنَّ *præco, nomen constellacionis*.

لَاتِفَهُنَّ *et ap. Nestor.* **لَاتِفَهُنَّ**, *ar.* **لَاتِفَهُنَّ**, *fut.* **لَاتِفَهُنَّ** *et لَاتِفَهُنَّ*, inclinavit, genuflexit, *absol.* *vel seq.* **لَاتِفَهُنَّ**, **لَاتِفَهُنَّ**; *procubuit, procedit in adoratione*.

Ethpa. مُعَامَّةٌ *id. q. Pe.*

Aph. مُعَمَّبٌ procumbere fecit, flectere fecit *genua.*

مُعَبَّاً genuflexio; concessus. مُعَمَّنٌ وَمُهَكَّتٌ مُمَبِّنٌ nobiles confessores *regis.*

مُعَبَّاً genuflexio.

مُعَبَّلٌ, *f.* مُعَمَّدَةٌ expansionis capax, *cfr. ar.* أَقْعَلَ se expandit *flos vitis.*

مُعَبَّدٌ, *pl.* مُعَمَّدَةٌ fascia; catena; vinculum lapideum ad pinnos murorum obfirmandos; *in pl. lilium.*

مُعَبَّلٌ pedum pastorale; *cfr. حَمَلٌ*, *s. حَمَلٌ.*

مُعَنَّى, *fut.* مُعَنَّى enucleavit, decorticavit; *intrans.*, luxatus est.

مُعَنَّى, *emph.* مُعَنَّى calix seu petiolus glandis; *it.* tumor; cavitas conchæ, putamen *ovi*, fundus *putei*, *cfr. ar.* قَرْ, *id.* et קַשְׁרָה patina.

مُعَنَّى et مُعَنَّى concavus.

مُعَا, *heb.* קַפָּא, *ar.* قَفَّ, *fut.* مُعَا collectus est, se collegit; diversatus est; appulit, *cfr. ar.* زَقَّ; *nnq. trans.*, collegit, coacervavit; *it.* supernatavit. *Part. præs. act.*

مُعَا, مُعَا; subst. *v. infra.*

Part. *præt. pass.* مُعَا.

Ethpe. مُعَامَّةٌ dissipata est nebula; مُعَامَّفٌ كَحْمَانٌ appulit navis ad portum.

Pa. مُفَّ colligit.

مُفَّ et مُفَّ collectio, congregries; turba.

مُفَّ, *ar.* قَنَا. مُفَّa radix seu ima pars cervicis.

مُفَّ acervus, rudera; quisquiliæ fluvii; jus seu pinguedo ollæ supernatans.

مُفَّ species suffimenti; *it.* corbis, *ar.* قَنَّة.

مُفَّ et مُفَّ, fut.

contractus est, corrugatus est, se contraxit *præ horrore*; transit. contraxit; coarctavit, collegit; *cfr. قَبَضَ* *id.* Part. *præt.* مُفَّa corrugatus; exhorrens.

Ethpe. مُعَفَّا contractus est; corrugatus est.

مُفَّa corrugatio; contractio nervorum.

مُفَّa *f.*, herinaceus *cfr. æthiop.*, *heb.* טֵז et *ar.* قَنْدٌ; *it. m.* κόπικον, frustum carnis.

مُفَّa, *ar.* قَيْزَرٌ, nomen mensuræ aridorum.

مَفْتُحٌ, ar. قَنْخَ, fut. مَفْتَحٌ,
colaphizavit, contudit, allisit;
trop. coercuit cupiditates,
cfr. ar. حَبَّ. Part. pass.
مَفْسُدًا فَلَامِ; مَفْسُدًا
contundatur os tuum.

Pa. مَفْكَرٌ colaphis percussit;
verberavit, contudit, allisit;
afflixit, vexavit; trop. re-
pressit, coercuit; redarguit,
confutavit. مَهْمَقَ مَهْمَدًا
diebus vexatus: ætate pro-
vectus.

Ethpa. مَأْمَقٌ pass.; trop.
afflictus est.

مَهْمَسَا colaphizatio; verberatio,
vexatio; trop. repressio, cas-
tigatio, confutatio; coerci-
tio voluntaria. مَهْمَسَا بِمَهْمَسَا
epistola objurgatoria.

مَهْمَسِنَا colaphizans; vexans;
coercens.

مَهْمَسَةً per modum repre-
hensionis.

مَفْهُومًا saltatio.

مَفْهُومٌ saltator.

مَفْهُومًا et مَفْهُومًا, plur. v.
مَفْهُومًا, capita. سَهْ مَفْهُومًا
censem seu tributum capitis
collegit.

مَفْلَمٌ κάπηλος, caupo; it. ge-

nus pallii. حَمْدَ مَفْتَلًا caupona;
it. penus.

مَفْلَمٌ caupo; leno; it. lupanar.
مَفْلَمَهْ caupo.

مَفْلَمَهْ et مَفْلَمَهْ usurpat.
c. vel حَبَّ more caupo-
num mercatus est, inde fra-
davit.

مَفْلَمَهْ adulteratus; it. vafer.
مَفْلَمَهْ forte a κατεργασίᾳ,
suppellex domus.

مَفْلَمٌ, fut. مَفْهُومٌ detra-
xit, denudavit; amovit, dis-
sipavit; it. collegit, conclu-
sit, ar. حَفَلًا. قَلَ مَفْلَمٌ
nubem dissipavit: rem elu-
cidavit. Part. act. مَفْلَمٌ
subst. v. infra.

Ethpe. مَأْمَقٌ detractus est,
denudatus est; sublatus est,
destructus est; gramm., eli-
sa est littera.

Ethpa. مَأْمَقٌ dissipatus est,
amotus est.

Aph. مَفْلَمٌ detexit.

مَفْلَمٌ horreum; thesaurus, locus
abditus, latebræ, aditus; trop.
arcana; مَفْلَمٌ دَهْ cau-
pona. مَفْلَمٌ وَهْ abdita
sylvarum.

مَفْلَمٌ fascia capitis, cidaris.

مَفْلَمٌ manipulus; involucrum;

it. turma viatorum simul peregrinantium, *id. q. ar.* قَافِلَةً (gall. caravane).

مَفْعُولٌ, *pl.* مَفْعَلَاتٌ, *ar.* قَفْلٌ, sera ; repagulum.

مُفْعَلٌ faber serrarius, *ar.* قَفَالٌ.

مَفْعَلٌ et مَفْعَلٌ, *v. supra s.* مَفْعَلٌ.

مَفْعَلٌ, *pl.* مَفْعَلَاتٌ res compli-
cata et multiformis ; *trop.* confusio.

مَدْمَعَكْنَةً amotio, detectio.

مَفْعَلٌ et مَفْعَلٌ, *pl.* مَفْعَلَاتٌ etc. κεφάλιον, capitulum ; summa pecuniae (gall. capi-
tal).

مَفْعَلٌ κεφαλή, capitulum.

مَفْعَلٌ et مَفْعَلٌ κεφαλωτός, clavus capita-
tus ; *it.* porrum capitatum.

مَفْعَلٌ κέφαλος, cephalus
piscis ; κεφαλαιος, capitalis.
مَفْعَلٌ placenta apibus uti
pabulum data.

مَفْعَلٌ, *pl.* مَفْعَلَاتٌ κεφαλίς,
capitellum (gall. chapiteau).

مَفْعَلٌ καπνός, fumus.

مَفْعَلٌ κάπνιος, *it.* مَفْعَلٌ κάπνη, fumaria planta.

مَفْعَلٌ, *ar.* قَبْضٌ, *fut.* مَفْعَلٌ contraxit, retraxit ; colle-
git, manum suam contraxit,
inde trop. se abstinuit ; de-

stitit a re ; cohibuit manum alicujus, *i.e.* impedivit ; abso-
lute sine اَبْسُولُوتٍ cohibuit ; *nng.* removit rem ; *it.* coacervavit,
concessit, *inde nng.* comprehendit res aliam ; abbrevia-
vit rem, verba ; *absol.* summatim dixit ; *intrans.* se con-
traxit, se retraxit. مَفْعَلٌ اَبْسُولُوتٍ اَبْسُولُوتٍ apprehendentes
extulerunt eam (Saphiram) et sepelierunt. *Part. pass.*
مَفْعَلٌ ; *adverb.* حَمْقَنَتَهُ breviter.

Ethpe. مَفْعَلٌ pass. et refl.
اَبْسُولُوتٍ اَبْسُولُوتٍ contracta est manus ejus, *trop.* remotus est a munere suo.

Ethpa. مَفْعَلٌ retractus est, remotus est, se retraxit.

Aph. مَفْعَلٌ removit ; *it. de-*
nom. a مَفْعَلٌ, pavimento
munivit.

مَفْعَلٌ st. cst. مَفْعَلٌ, ap. Nest.
مَفْعَلٌ, palma manus ; *it. ut*
seq.

مَفْعَلٌ contractio ; convulsio
nervorum ; poples ; collectio,
commeatus ; frustum panis ;
corbis, panarium ; *pl.* مَفْعَلٌ
vel مَفْعَلٌ مَفْعَلٌ horrea.

مَفْعَلٌ claustrum ; nomen ver-
sus, seu hemistichii ; poples ;

it. κύπρος, cuppa; it. κύπρος,
v. s. مَوْدَ.

مَوْهَمَةً tunica lanae, cfr.
χόπασσοις, et pers-ar. قُبَّاز
مَوْهَمَةً contractio.

مَوْهَمَةً contraetio, spasmus;
abbreviatio. حَمْفَهَمًا sum-
matim, compendiose.

مَوْهَمَةً , ar. قَصَّصَ , cavea (gall.
eage); sporta.

مَوْهَمَةً junctura poplitis, ge-
num.

مَوْهَمَةً κυψάκης , vas olei.

مَوْهَمَةً , ar. قَنَقَ , fut. مَوْهَمَةً ,
resedit a motu moles aqua-
rum, concrevit, cfr. مَوْهَمَةً ; it.
substitut homo.

Pa. مَوْهَمَةً incubuit, fovit pul-
los.

مَوْهَمَةً , Aph. v. مَوْهَمَةً .

مَوْهَمَةً et مَوْهَمَةً incubatio avis.

مَوْهَمَةً , مَوْهَمَةً incubans.

مَوْهَمَةً مَوْهَمَةً incubatio avis.

مَوْهَمَةً noctua.

مَوْهَمَةً cyperus arbor; pix.

مَوْهَمَةً , ar. كَفَرْ , pix, cfr. مَوْهَمَةً .

مَوْهَمَةً , دَعَى , v. denom., pice ob-
duxit.

مَوْهَمَةً κάπρος , caper.

مَوْهَمَةً capparis planta, ar. كَبَرْ .

مَوْهَمَةً helleborus.

مَوْهَمَةً nomen avis.

مَهْرَأً , heb. מַהְרָא , ar. قَصَّصَ fut.
نَحْرَأَ fregit panem, inde confe-
cit Sacramentum Eucharistiae ; it. absol. consecravit
sanctam Eucharistiam. Part.
pass. مَهْرَأً , subst. frag-
mentum, particula ; in pl.
مَهْرَأً fragmenta panis.

Ethpe. مَهْرَأً pass. ; it. stipula-
tus est, cfr. مَهْرَأً .

Pa. مَهْرَأً fregit panem.

Ethpa. مَهْرَأً pass.

مَهْرَأً , مَهْرَأً , f. emph. مَهْرَأً fractio,
spec. fractio panis ; in-
de consecratio Eucharistica ;
fragmentum, frustum ; parti-
cula consecrata.

مَهْرَأً fragmentum, particula ;
particula eucharistica conse-
cera ta vel consecranda.

مَهْرَأً , ar. قَصَّابَ , lanius.

مَهْرَأً , heb. מַהְרָא , fut. نَحْرَأَ
hariolatus est, divinavit.
Part. act. مَهْرَأً , مَهْرَأً ; مَهْرَأً
مَهْرَأً necromantiam exer-
cens.

Pa. مَهْرَأً hariolatus est ; cfr.
neo - ar. مَهْرَأً adjuravit, exor-
cizavit.

مَهْرَأً divinatio ; divinationis
pretium; vaticinium, nng. di-

vinum oraculum ; مُوْمَنْهَا conjectura ; it. farina hordeacea *vel* miliacea, placenta in divinatione adhibita ; fuligo.

مُوْمَنْتَهَا , it. مُوْمَنْهَا , pl. مُوْمَنْهَا ignis vapores.

مُوْهَمَّهَا hariolus ; divinator, vates, f. مُوْهَمَّهَا , pl. مُوْهَمَّهَا divinatio, vaticinium. مُوْمَنْهَا hariolus.

مُوْهَمَّهَا inus., cfr. قَصَمَ confregit.

Ethpe. مُوْلَمَّا conferatus est, comminus est.

مُوْهَمَّهَا et مُوْهَمَّهَا fractio; corrugatio. مُوْهَمَّهَا et مُوْهَمَّهَا , مُوْهَمَّهَا heb. קְרִיעָה , casia.

مُوْهَمَّهَا et مُوْهَمَّهَا , heb. נַצֵּק , cfr. ar. قَصَفَ et قَصَفَ emaciatus est, fut. نَهْرَكَ angustiatus est, anxius fuit ; moleste tulit c. حِلْيَةِ rei vel حِلْيَةً ; abhorruit a, c. حِلْيَةً ; invidus fuit ; it. iratus est ; objurgavit. Part. præt. مُوْهَمَّهَا , مُوْهَمَّهَا angustiatus, tristis ; it. tenuis ; subst. putamen ovi confractum, cfr. ar. قَصِيفَ confractus a medio ; it. vestis tenuis.

Ethpe. مُوْلَمَّا مُوْهَمَّهَا tristis fuit, morbo laboravit.

Pa. مُوْهَمَّهَا cruciavit, molestavit Ethpa. مُوْلَمَّا ægre tulit ; avarus fuit.

Aph. مُوْهَمَّهَا invidus fuit.

مُوْهَمَّهَا angustiæ ; tristitia, invidia ; avaritia.

مُوْهَمَّهَا avaritia.

مُوْهَمَّهَا , heb. נַצֵּק , ar. قَصَمَ , fut. قَصَمَ et نَهْرَكَ præcidit, totundit capillos etc.; trop. decidiit, definivit ; aestimavit, stipulavit, pactus est ; præscriptis, c. حِلْيَةِ rei; remisit peccata Deus, nnq. absol. ignovit ; it. convenit res. مُوْهَمَّهَا بِمُوْهَمَّهَا ex denario cum eo convenit. Part. act. مُوْهَمَّهَا . Part. pass. مُوْهَمَّهَا قَلَّا ; مُوْهَمَّهَا tonsus, barba abrasus.

Ethpe. مُوْلَمَّا pass.; trop. imputatus est.

Pa. مُوْهَمَّهَا concidit,

Ethpa. مُوْلَمَّا imputatus est.

Aph. مُوْهَمَّهَا retribuit ; in compensationem accepit ; terminavit rem.

مُوْهَمَّهَا , nnq. حِلْيَةِ , emph. حِلْيَةِ , abscissio, inde finis, terminus ; مُوْهَمَّهَا vel absol. حِلْيَةِ وَسْتَانَ , finis vitae ; مُوْهَمَّهَا dies termini : dies judicii. أَبْوَهَمَّهَا حِلْيَةِ a morte correptus est. حِلْيَةِ حِلْيَةِ

هذا et **هذا**, *heb.* **אָמַר**, *fut.*
هذا vocavit, appellavit ;
invocavit *Deum*, etc. *uti testem* ; advocabit, revocabit,
nominavit *ad munus*, promovit ; proclamat ; *per extens.*, jussit, indixit ; *trop.*
movit *causam belli* etc. seu
provocabit ; *it.* cantavit *gallus* ; clangorem edidit *tuba* ;
legit *librum*, studuit, *id. q. ar.* **قَرَأَ** ; *seq.* **هذا**, didicit
scientiam ab aliquo. **هذا** **حَمْنَا** imploravit, appellavit ad.
هذا **حَمْنَا** tuba cecinit.
هذا **حَمْنَا** **حَمْنَا** eum capitatis signo
salutavit. **هذا** **حَمْنَا** eum ad se accersivit.
هذا **حَمْنَا** proclamat. **هذا** **حَمْنَا** nomen ei tribuit. **هذا** **حَمْنَا** **حَمْنَا** eum salutavit.
هذا **حَمْنَا** **حَمْنَا** **حَمْنَا** de seipsis falso praedicabant
quod.. *Part. act.* **هذا**, **حَمْنَا** ;
pl. **هذا** **حَمْنَا** ; **هذا** **حَمْنَا** *vel*
هذا **حَمْنَا** tuba clangentes ; *impers. c. هـ* : **هذا** **حَمْنَا** num legisti libros ? *emph. et subst. v. infra. Part. pass.* **هذا**, *pl.* **هذا**, *emph. هـ* ; **هذا** *dies proclamatus* : *dies festus*.

Ethpe. **بَهْلَى** *pass.* ; *it.* provocavit ad pugnam, fortiter dimicavit.
Aph. **بَهْلَى** *vocare fecit* ; *legere fecit*, *ediscere jussit libros*.
Part. act. **هـ**, **حَمْنَا** ; *subst.* **هـ** **حَمْنَا** **أَوْتِلْلَى** *cantus galli*.
Ettaph. **بَهْلَلَى** contendit, adversatus est.
هـ, *et usitatius emph.* **أَمْهُمْ** , *pl.* **أَمْهُمْ** , *c. suff.* **هـ** , *clamor* ; nominatio *ad munus ecclesiasticum* : *vocatio*, *revo- catio* ; *appellatio juridica* ; *invocatio* ; *lectio* ; *modus legendi textum* ; *textus ipse* ; *grammat.* *vocativus*, *ut* **أَمْهُمْ** ; *it.* locustæ species.
هـ, **هـ** *vocatio* : *invocatio* ; *lectio*, *ars legendi* ; *materia lectionis* ; *scientia* ; *it.* *con- tentio*.
هـ *lector*.
هـ *contentio*, *litigatio* ; **هـ** *vel abs.* **هـ** **وَكْلَى** *pollu- tio nocturna*.
أَمْهُمْ *lector* ; *Lector*, *unus ex ordinibus minoribus* ; *gramm.* *vocativus* : *f.* **أَمْهُمْ** *et* **أَمْهُمْ** *id.* ; *it.* *sedes ad legendum publice in ecclesia*, *pulpitum* ; *vas rostratum in ecclesia adhibitum*.

مَهْمَلًا appellatio; munus lectoris.

مَهْمَلَة et مَهْمَلَة contentiose; tortuose.

مَهْمَلًا, مَهْمَلًا contentiosus.

مَهْمَلًا contentio; pervicacia.

مَهْمَلًا, pl. مَهْمَلًا, heb. كورا, ar. قرية, trabs.

مَهْمَلًا trabi similis.

مَهْمَلًا lectionem docens.

فَكَمْحَدًا مَهْمَلًا legibilis; مَهْمَلًا lectu faciles litteræ; ap. gramm., nomen in vocabulo.

مَهْمَلًا in vocativo casu.

مَهْمَلًا, st. emph. مَهْمَلًا collective usurpatum, pl. مَهْمَلًا, st. const. pl. مَهْمَلًا, c. suff. مَهْمَلًا, مَهْمَلًا vel مَهْمَلًا, مَهْمَلًا etc., pagus; suburbium, prædia.

مَهْمَلًا, heb. كریه, ar. قرية, nom. unit., st. cst. مَهْمَلًا et مَهْمَلًا, pl. مَهْمَلًا, st. cst. مَهْمَلًا pagus; urbs. مَهْمَلًا بِأَوْخَادًا urbs munita. مَهْمَلًا et مَهْمَلًا بِمَدَحَّاتًا urbs regia. مَهْمَلًا بِمَنْتَادًا urbicula, pl. مَهْمَلًا مَهْمَلًا dim., viculus.

مَهْمَلًا rusticus, paganus; trop. rudis, illiteratus.

مَهْمَلًا rusticitas; commoratio ruri, seu in pago; vita rustica; trop. asperitas agrestis.

مَهْمَلًا, heb. كرم, ar. فرب et قرب, fut. نُهْمَلَت appropinquavit, adstitit; accessit ad, cum لَمْ, لَمْ, vel بَلْ; nnq. invasit, aggressus est; ad mulierem accessit, c. لَمْ; seq. al. verbo, in proximo fuit, prope fuit ut; impers. لَمْ instat, imminet.

Pa. مَهْمَلَت appropinquare fecit; adduxit, admovit, adjunxit; adhibuit; protulit, obtulit donum etc., inde sacra mysteria celebravit, absol. vel seq. مَهْمَلَت مَهْمَلَت allocutus est. مَهْمَلَت كَذَبَ مَهْمَلَت eum coram se sistere jussit.

Ethpa. مَهْمَلَت pass.; it. accessit, tetigit, attigit etc., ut in Pe.; sancta Eucharistiae mysteria recepit, ar. شَرَبَ; أَمْهَمَت; تَهَبَ; حَمَدَهَمَا ad regiam dignitatem promotus est.

Aph. مَهْمَلَت congressus est, pugnavit, c. دَعَ, كَهْمَدَ لَمْ vel لَمْ expugnavit locum,

c. مَهْرَبٌ حَلَّ أَهْرَبْ . حَلَّ igne probatus, igni resistens.

Ettaph. مَهْرَبٌ impugnatus est, oppugnatus est.

مَهْرَبٌ , ar. فَزْبٌ , vicinia, proximitas ; adverbial. c. præpos. حَمْهُوكَ sub brevi; prope, fere, circiter ; حَمْهُوكَ prope ; circiter ; مِنْ مَهْرَبٌ e propinquuo, cominus ; in vicinia, prope.

مَهْرَبٌ , heb. קְרֵבָן , ar. قَرْبَانٌ , pl. مَهْرَبَاتٌ , oblatio, donum ; oblatio *Deo facta*, sacrificium ; oblata *Eucharistica* ; sancta ipsa Eucharistia ; sacrificium Missæ. كَهْ مَهْرَبٌ thesaurus templi, gazophylacium, *cfr.* διορθωτικός .

مَهْرَبٌ eucharisticus.

مَهْرَبٌ accessus, congressus ; bellum ; obsidio. حَجَّ مَهْرَبٌ حَلَّ pugnavit contra. حَجَّا وَمَهْرَبٌ bellatores. سَهْرَبٌ وَمَهْرَبٌ cogitationes inter se luctantes *aut* quibuscum configitur.

مَهْرَبٌ militaris ; subst.. sagum.

مَهْرَبٌ , مَهْرَبٌ bellator ; pugnax.

مَهْرَبَاتٌ strenue.

مَهْرَبَاتٌ militia, virtus militaris.

مَهْرَبَاتٌ militaris.

مَهْرَبٌ oblatio ; delatio juridica, expostulatio.

مَهْرَبٌ accedens ad sanctam synaxim.

مَهْرَبٌ , مَهْرَبٌ accessus ; sacra Liturgia, sacrificium Missæ.

مَهْرَبٌ , f. emph. مَهْرَبٌ et c. suff., مَهْرَبٌ ,

propinquus, vicinus, qui prope est, præsens : consanguineus, affinis ; similis, verisimilis, conformis ;

مَهْرَبٌ consanguineus ;

مَهْرَبٌ حَسْنَةٍ ipsis propinquus ;

مَهْرَبٌ , contr. مَهْرَبٌ prope est, adest. حَسْنَةٍ

prope erat ut. حَسْنَةٍ مَهْرَبٌ

« حَسْنَةٍ » in eo erat ut caderet ; *impers.* لَوْلَى مَهْرَبٌ jamjam vesper erat.

مَهْرَبٌ حَسْنَةٍ حَسْنَةٍ de quibus verisimiliter dicendum est, quod inebriati sunt.

مَهْرَبَاتٌ proxime ; proximo tempore, brevi.

مَهْرَبَاتٌ proximitas, vicinitas ; præsentia ; affinitas.

مَهْرَبَاتٌ حَفَّةٌ fere tribus diebus.

مَهْرَبَاتٌ oblatio.

|Nōfō, v. *ibid.*

στραγγός, crystallus.

مَوَابِدُ **كُلُّ** **مَوَابِدٍ** glacies.

መልምት ቁጥር ۱۰ : አጋጣሪ ሌሎች፣
crystallinus humor.

فَمِنْهُ فَرِشَةٌ، fimbriæ.

هَمْدٌ وَمُكْهَمٌ et هَمْدٌ وَمُكْهَمٌ
 κροκόδειλος, crocodilus, cfr.
 هَمْدٌ وَمُكْهَمٌ.

نَمْهُ وْمَكْمَمْ مَنْهُوكْدَلْيَوْ،
nomen herbæ, eryngium.

କୁଣ୍ଡଳି^{କୁ} crocus.

أَذْعَنْتُ، *pers.* قِرْقَةٌ، *pileus seu vestis, speciat.* ecclesiasticus.

~~περισσότερον~~ κροκόμαργυρα, croci amurca.

|لوڻ، |لوڻا et مڻه etc. f.,
خروڙ، cera.

مَوْلَى *ap. Alchim.*, stannum.
مَوْلَى *أَرْبُورْ نُوكُومُو*, arbor nucum

avellanarum, *cfr.* مَلْوَأْ .

فَتَنَسْ, *heb.* פָּרַק, *ar.* قَرْعَةً, *fut.* قَرْعَةً *et* نَعْدَةً *calvus fuit;* *trop.* enudavit *rem, seu clare* revelavit, manifestavit. *Part.* *pass.* مَنْسَأْ ; manifes-
tus, clarus, evidens ; notus ; certus ; gramm., pronuntia-
tus, enuntiatus : evidens.

Aph. ۷۰۱ calvus factus est :

it. decalvavit; *trop.* expresse declaravit, enuntiavit.
Part. pass. لُحْمَةٌ; disertus; contentiosus.

Ettaph. **عَلِّيٌّ** manifestus factus est; gramm., pronuntiatus est.

Luise calvus.

أَمْهَوْسَةٌ calvities; caput cal-
yum.

وَمَنْدَلٌ calvus, *in pl.* مَنْدَلٌ
montes arboribus denudati;
it. cornibus destituta *ovis*, *pl.*
أَنْدَلٌ: *it. contusio.*

لَسْمٌ calvities; defectus cranium.

حَفْنَةٌ, pl. **حَفَّاتٍ** turbo; procella;
it. eicer. **حُفَّةٌ** **حُفَّةٌ** pyrethrum
planta.

لُقْلُعَنْتَ luculenter, clare.

حَمْسَةً evidentia ; **حَمْسَةً مُّسَهَّلًا** manifeste, expresse.

مُهْمَّةٌ disertus,

مَهْمَّةٌ ars diserte loquendi;
contentio.

عَنْدُ, fut. **تَعْنِدُ**, ar. **عَرَضَ**
et **قَرَطَ**, dissecuit, scalpsit.

وَمَنْدَبْ وَمَنْدَبْ inscripta denaria.

Pa. ፲፻፭ rosit.

پالیوم لانئوم pallium laneum.

فُرْسُتُمْ frustum carnis.

رَسُورٌ rosor ; scalprum ; it.
κερατόν, ceratum ; atramen-
tum.

مَهْدَى mercede conductor.

أَرْبَاطٌ et أَنْوَافٌ κερατίς, ar.
أَرْبَاطٌ ceratum arbor (gall.
caroubier).

مَهْلَكٌ et مَهْلَكٌ κεράτιον,
fructus ceratii ; it., ar. قِيرَاطٌ
nomen ponderis, scil. tertia
pars oboli.

مَهْلِكٌ dimin., nummus minu-
tus.

مَهْلَكٌ, ar. طُرْطُسٌ, porrum.

مَهْلَكٌ κρήτη, creta sic dicta a
Creta insula.

مَهْلَكٌ, ar. قُرْطَبٌ, tribulus, spi-
na. مَهْلَكٌ وَسْقَلٌ aparine
planta.

مَهْلَكٌ κράτος, potestas.

مَهْلِكٌ, ut أَنْوَافٌ, γέρατης, ar.
قِرَطَاسٌ, charta ; per extens., chirographum, li-
bellus. حَدِيدٌ وَهَمْلِكٌ charta-
rius.

مَهْلِكٌ κρατήρ, crater constella-
tio.

أَنْوَافٌ κάρταλλος, ar. قِرْطَلٌ,
cartallus, canistrum, corbis.

مَهْلِكٌ, ar. قُرْطَبٌ, præscidit.

مَهْلِكٌ sermo insulsus.

مَهْلِكٌ linea.

مَهْلِكٌ, ar. قِرْطَمٌ carthamus
tinctorius ; it. ut مَهْلِكٌ.

مَهْلِكٌ, it مَهْلِكٌ et مَهْلِكٌ nebula tenuis.

أَنْوَافٌ lat., craticula.

أَنْوَافٌ καρτερίς, abstinentia,
vita ascetica.

مَهْلِكٌ et مَهْلِكٌ lampas, id.
q. مَهْلِكٌ.

مَهْلِكٌ κρύπτη, squilla.

مَهْلِكٌ κρήτη c., κρήτον, κρήτων,
cereus (gall. cierge).

مَهْلِكٌ dimin. præc.

مَهْلِكٌ κριός, aries.

مَهْلِكٌ κριτής, judex.

مَهْلِكٌ et مَهْلِكٌ κρίνον,
lilium.

مَهْلِكٌ κρίσις, judicium.

مَهْلِكٌ et مَهْلِكٌ f., κριθή, hor-
deum ; it. hordeolus, tumor
in oculo (gall. orgelet).

مَهْلِكٌ κρίθιον, crithmum
planta.

مَهْلِكٌ καρχηδόνιος, carbunculus gem-
ma, ar. كَرْكَنْدَلَةٌ.

مَهْلِكٌ corvus, id. q. مَهْلِكٌ.

مَهْلِكٌ, heb. מְלַקֵּת, fut. مَهْلِكٌ
obtexit, obduxit pelle etc.,
incravat auro, c. acc. pers.
et rei vel ا rei ; stravit.
Part. pass. مَهْلِكٌ ; subst., in

- emph.** مَعْدَداً libum uvarum passarum.
- Ethpe.** أَمْهَنْ pass. Part. مَهْمَدْ ; acu picta tela.
- Pa.** مَهْ ut Pe. ; expandit.
- مَهْمَدْ** tegumentum, velamentum, ar. قِرَامْ ; stragulum ; cælatura.
- مَهْمَدْ** οὐρός, neo - ar. قُرْنَةْ , truncus arboris, trop. truncus corporis.
- مَهْمَدْ** supercilia conjuncta habens.
- مَهْمَدْ** et مَهْمَدْ membrana coridis vel abdominis, peritonæum.
- مَهْمَدْ** κούβη, caulis, brasica.
- مَهْمَدْ**, v. s. مَعْدَهْ .
- مَهْمَدْ** corrugatio frontis.
- مَهْمَدْ** κεφαλίς, ar. قرميد , tégula, later (gall. brique), pl. مَهْمَدْ et مَهْمَدْ .
- مَهْمَدْ** καλυχάριον , theca scriptoria (ar. مَثَاجِمَةْ).
- مَهْمَدْ** et مَهْمَدْ κέραμος , κεραμίς , hydria, vas ; it. signum Zodiaci.
- مَهْمَدْ** κρεμαστός , suspensus.
- مَهْمَدْ** f., heb. קָרֵן , ar. قُرْنَةْ , pl. مَهْمَدْ et مَهْمَدْ cornu anima-
- lis**; trop. cornu altaris etc. ; inde angulus, cacumen, extremitas cuiuscumque rei, apex ; cornu seu ala exercitus ; vas e cornu factum, tuba cornea ; trop. et symbolice : robur, potentia ; مَهْمَدْ alatum cornu : superbia ; it. sors seu caput summæ (id. q. ar. رَأْسُ الْقَالِ et gall. le capital) ; مَهْمَدْ مَهْمَدْ caput summæ cum fœnore. مَهْمَدْ وَجْهْ fœnum græcum planta. مَهْمَدْ cutis cornea in oculo. مَهْمَدْ وَدْنَى hœdus. مَهْمَدْ سَمْنَا rhinoceros. مَهْمَدْ وَقْدَهْ eum dignitate vel potentia auxit. مَهْمَدْ وَقْدَهْ cornu h. e. auctor salutis meæ.
- مَهْمَدْ et مَهْمَدْ cornutus.
- مَهْمَدْ plumbus, v. مَاهْ .
- مَهْمَدْ κορώνη , cornix.
- مَهْمَدْ pessulus.
- مَهْمَدْ urna rostro munita, cfr. مَهْمَدْ , s. مَهْ .
- مَهْمَدْ tortoise.
- مَهْمَدْ , pl. مَهْمَدْ cistæ jumento impositæ utrinque dependentes, ar. مَغْرُونْ conjunctus.
- مَهْمَدْ , v. s. مَهْ et sub مَهْ .
- مَهْمَدْ hortulanus.
- مَهْمَدْ κρανίον , cranium.
- مَهْمَدْ , v. s. مَهْ .

مَهْوَنْدَا , v. s. مَهْوَنْدَا .	مَهْوَنْدَا astutia, calumnia.	مَهْوَنْدَا κέρασος, cerasus arbor.
مَهْوَنْدَا velum muliebre, ar. مَهْوَنْدَا et مقنعة ; cfr. مَهْوَنْدَا .		مَهْوَنْدَا κερασέα, ar. قَرَاسِيَّة, cerasus arbor, cerasum.
مَهْوَنْدَا , ar. قَرَنْفُل , caryophyl-lum (gall. giroflee).		مَهْوَنْدَا rami abscissi.
مَهْوَنْدَا , heb. כְּרָב , fut. نَهْوَنْدَا aruit, duruit; asper factus est; cfr. ar. قَرَس riguit frigore.		مَهْوَنْدَا , مَهْوَنْدَا , cfr. مَهْوَنْدَا et ar. قَرَعَة , cueurbita.
Ethpe. مَهْوَنْدَا induruit.		مَهْوَنْدَا clitellæ; hippocera (gall. valise); pelvis; capistrum jumenti; sacculus pabulatorius.
Pa. مَهْوَنْدَا asper factus est.		مَهْوَنْدَا , ut مَهْوَنْدَا , pallium muliebre.
Ethpa. مَهْوَنْدَا pugnavit, de-nom. a مَهْوَنْدَا .		مَهْوَنْدَا , pl. مَهْوَنْدَا colocynthis.
Aph. مَهْوَنْدَا exaruit, duruit. مَهْوَنْدَا ariditas; duritas; trop. durities animi, acerbitas verborum.		قَرَعَة a مَهْوَنْدَا percussit.
مَهْوَنْدَا , مَهْوَنْدَا siccus, durus, as-per; iracundus.		مَهْوَنْدَا - Ethpa. مَهْوَنْدَا tecto mu-nitus est.
مَهْوَنْدَا vectis ligneus quo eru-untur lapides.		مَهْوَنْدَا servorum filius, ar. مَهْوَنْدَا it. accessus, cfr. مَهْوَنْدَا .
مَهْوَنْدَا mutilus.		مَهْوَنْدَا velum.
مَهْوَنْدَا et مَهْوَنْدَا κακόρος , tempus; tempus adversum, calamitas; bellum, prælrium; it. ut مَهْوَنْدَا , مَهْوَنْدَا calumniatus est, ut مَهْوَنْدَا .		مَهْوَنْدَا lampas.
مَهْوَنْدَا vox lat., currus; cfr. مَهْوَنْدَا et gall. carrosse.		مَهْوَنْدَا , Parel v. مَهْوَنْدَا , con-traxit.
مَهْوَنْدَا et مَهْوَنْدَا κακόπιον , mixtura.		مَهْوَنْدَا κακόπιον, lignum aro-maticum.
مَهْوَنْدَا vestis species.		مَهْوَنْدَا pileus ecclesiasticus, cfr. مَهْوَنْدَا .
		مَهْوَنْدَا supplex vilis; quis-quiliae.

مَنْزِلٌ, fut. **مُنْتَهٰ** discepit
verbis, exprobravit; cfr. ar.
مَرْصٌ momordit, obtrectator

مَوْسُولَةً coma; cfr. مَهْلَكَةً s., et مَهْلَكَةً clavus.
مَهْلَكَةً tremor febrilis (*gall. frisson*).

هَنْرِيٌّ id.
مَنْزُومٌ pruina; perniones,
 tumores e frigore in manibus
 erumpentes (*gall.* engelures).
هَنْزِينٌ vehemens frigus, *ar.* قَارِسٌ.
مَنْوَحٌ et **مَنْوَحَةٌ**, pl. قَوْحَةٌ
 urtica.

مَهْوَزْ horror febrilis.
مَهْوَلْ, heb. מַכְרָה, talus pedis; carpus brachii. **مَهْوَزْ** sterilitas frugum.

Ethpalp. ɛθpɔl̪ verb. denom.,
prosecutus est.

حُكْم urtica.

فَرْقَنْ, ar. فَرْقَنْ, et *Polp.* فَرْقَنْ
glocivit gallina.

لُجْهَةٌ glōcītatiō gallinæ; it. capistrum; terebra.

فَهْمَنَا vox gallinæ ; murmur
intestinorum, ar. قَرْقَةٌ ; flatus
venti ; tinnitus aurium.

સંડાલ sandalium.

سَانْدِلُورُومْ sandaliorum confector.

فَذُخْرًا vadum.

الْمُحْكَمَةُ *ingluyies avis.*

اًهُنْدَى : q. اًهُنْدَى

رِتِيْكُلُومْ قَنْهَفْتُمْ مَذْمُومَةٌ اَخْوَنْبَخْتُونْ ,
reticulum capitis.

قَبْسُرٌ capistrum.

பூஷ்ண impensæ : *it.* planities.

Lásio atramentum.

καρκίνος, cancer
animal et signum Zodiaci.

κύρκοις; **κύρκησις**, circus,
circenses.

κίρκος *níxos*, circus; *pl.* *κίρκοι* *etc.*; *it.* circenses *ludi*.

W. f., craticula.

μα—δι—τό glutinum, *cfr.*
forte σαρκοκόλλα.

هَرْبَاجُون harpago; indusium, ar. قرقل.

مَكْبُر torques gemmis

فِبُّلَة fibula, annulus.
كَرْوَز κόραξ, corvus, cfr.

فَهُمْ et **فَهُمْ**; *it.* latruncularum ludus.

لَعْنَةُ pica avis.

מֶמְעֵדָה, pl. **מֶמְעָדָה** et **מֶמְעָדָה** ; *cranium, caput, cfr. מֶמְעָדָה* et *מֶמְעָדָה*, *it. cfr. rad. מַעַד* et *מַעַד* ; *per extens., vertex montis, etc. cacumen ; trop. præsul, primas, princeps.*

مَنْعَفٌ verb. denom., caput
truncavit.

ଫିଲ୍ c. deriv., v. s. **ଫିଲ୍ଦ**.

مَنْمَهْفَا f., *kéρκουρος*, ar.
فُرْقُوزَ, parva cymba, navicula.

فَمَّا strepitum edidit, c. **وَ**
rei, cum strepitu concussit;
confregit; *trop.* vana locutus
est.

Ethpalp. مَهْلِكٌ pass. ; timore
percensus est.

جُمْدٌ; **جُمْدٌ** concussio; titillatio.

مَقْرِنٌ, ar. قَرْنٌ, fut. نُقْرِنٌ, nnq.
مَفْرُونٌ frigidus fuit vel factus
 est; friguit; **مَكْرُونٌ** id.;
 trop. torpuit manus. Part.
 præs. مَفْرُونٌ frigidus.

Aph. مَرْجِعٌ *refrigeravit. Part.*
act. et pass. مَرْجِعٌ, *nng.* مَرْجِعٌ,
f. مَرْجِعًا.

Pau. ؛ هـ frigidum reddidit ;
frigidus fuit.

Ethpau. ةَهْلَكْلِي frigidus factus est.

مَهْوَا, *heb.* -פָּה, *ar.* فَهْوَ frigus.

رِفِيرِجِرَاتِيُونْ refrigeratio ; رِفِيرِجِرَاتِيُونْ refrigeratio animæ : consolatio, *cfr*, *ar.* قُرْةُ الْعَيْنِ refrigeratio oculi : consolatio.

جَنْدَلٌ، ar. جَرْنَيْهُ gyrinus (gall. têteard).

قارورة *pl.* مُّنْهَوْمًا, ar. ampulla, vas vitreum.

فِرْجِي refrigeratio, frigus ;
catarrhus.

فَرِيدُوسٌ, **فَرِيدُوسٌ** frigidus; trop.
piger; subst. massa farinæ
nondum fermentata; pl. **فَرِيدُوسٌ**
aquæ frigidæ; f. emph.
لِبَسْتُونٌ, subst. tremor febri-
lis.

فِرْجِيَّة frigiditas.

frigus; *it.* frigidus.

مَهْرَجْنَى refrigeratorius; *it. al.*
sensu, v. s. **مَهْرَجْنَى**.

מַחְמֵדָה *et* **מַחְמֵדָה** aquarium, *cfr.* **קֹור** *id., a.* **pu-**
teum *fodit.*

مَهْنَدْ لِلرِّيْفِيرِجِيُوْنْ | refrigeratio.

مِنْجَدٌ refrigeratorius.

أَلْهَمَهُ فَرِيْدَةُ frigidita

مَرْعَةٌ (*lat.* *carrus*), *carrarius*.

فِرَقَتْ, fut. **فِرَقَتْ** friguit;
 cfr. ar. قَرَسْ id. Part. præs.
فِرَقَتْ frigens. Part. præt.
فِرَقَتْ; subst. **فِرَقَتْ** vel **فِرَقَتْ**,

lac, colostrum ; *neo - ar.* قرش
se coagulavit lac.

Pa. مُفْعِلٌ frigefecit.

Ethpa. مُفْعَلٌ obumbratus est.

رُمْدَانٌ, ar. قنس, frigus ;
rheuma ; *it.* colostrum.

رُمْدَانٌ coagulatio ; contignatio.

رُمْدَانٌ quisquiliae, spec. fluvio su-
pernantes; sterquilinium ;
it. *ut* مُهْمَدٌ rheuma.

رُمْدَانٌ et مُهْمَدٌ مُهْمَدٌ colostrum.

رُمْدَانٌ spuma vini, acetii.

رُمْدَانٌ species nummi, *cfr.* ar.
پیاstra.

رُمْدَانٌ globulus.

رُمْدَانٌ canalis.

رُمْدَانٌ, pl. مُتَأْلِمَاتٌ *id.* q.
الْمُهْمَدٌ *q. v.*

رُمْدَانٌ, *heb.* נְשָׁפֵךְ, ar. قَسَّا, duruit; *exstat in partic.* præter. رُمْدَانٌ, f. emph. مُفْعَلٌ, pl. m. مُفْعَلٌ ; emph. مُفْعَلٌ, f. مُفْعَلٌ, emph. مُفْعَلٌ, durus, asper, difficilis, severus ; gravis, vehemens res ; durus animo, obstinatus; crudelis, immitis, inclemens ; سَمَاءٌ مُفْعَلٌ animalia indomita, feræ, *opp.* *ad* سَمَاءٌ مُفْعَلٌ cicurata animalia ; *apud gramm.*, dura littera ; *c.* مُفْعَلٌ pers. مُفْعَلٌ fortior ;

difficilior superatu res, ægre ab aliquo attingenda res.

مُفْعَلٌ et مُفْعَلٌ *duri corde, duri cervice* : obstinati; subst. مُفْعَلٌ duræ res ; فَبْ مُهْمَدٌ دُمٌ dum ei verba probrosa dicebant ; *it.* *f.* emph. et subst. *v. infra.*

Pa. مُفْعَلٌ induravit, aggravavit ; oppressit, *c.* حَكَ pers. et حَكَ rei ; *ap.* gramm., dure pronuntiavit aliquam ex litteris حَكَ دُعَةً , puncto indurationis instruxit has litteras. مُفْعَلٌ آقَى induravit faciem suam, dure se gessit, sœviit, *c.* حَكَ pers. ; *it.* absol. obstinatus, contumax evasit.

Part. pass. مُفْعَلٌ ; pl. f. مُفْعَلٌ ; apud gramm. puncto indurationis instructæ et sine aspiratione pronuntiatæ litteræ.

Ethpa. مُفْعَلٌ pass. et refl. ; durum se exhibuit, dure tractavit *c.* حَكَ pers. ; fortior fuit, superavit, *c.* حَكَ ; impers. لَا مُفْعَلٌ حَكَ durum tibi est.

Aph. مُفْعَلٌ aggravavit, durum fecit.

مُفْعَلٌ durities, severitas, crudelitas ; gravitas, arduitas,

sima pars psalterii ; *it.* hymnus sedendo decantatus.

﴿٩﴾ saxum, rupes ; *it.* lampas, candelabrum.

Pa. ﴿٩﴾ verb. denom., saxosus fuit.

﴿١٠﴾  ،  ،  ، purus, *pl.*   puri nomen sectae hereticorum.

﴿١١﴾  ،  ،  ، se connubio junxit.

﴿١٢﴾  ،  ،  ،  ، purgativus.

﴿١٣﴾  ،  ، elyster.

﴿١٤﴾  ،  ،  ، mundities.

﴿١٥﴾  ،  ، canalis ; *it.*, κάνθαρος, cantharus (*gall.* jet d'eau).

﴿١٦﴾  ،  ،  ، stercus, purgamentum.

 ،  ،  ، etc.,  ، depositio a dignitate, a munere.  ،

 ،  ،  ، sententia depositionis ; *it.* κάθαρσις, purificatio.

﴿١٧﴾  ،  ， verb. denom., depositum

a dignitate, a munere, excommunicavit.

Ethpal.  ،   pass.

 ،   depositio ab officio.

﴿١٨﴾  ، fut.   fixe stetit, inhæsit; *it.* nnq. trans. ut *Pa.*

Pa.   infixit ; *it.* exsiccavit.

Palp.   in cachinnos erupit, *absol.* vel seq.  .

Aph.   infixit ; defixit oculos, mentem, c.   rei ; *it.* *absol.* defixe intuitus est.

Part. act.  ، nnq.  ،  . *Part. pass.*  ،  .

 ،  ،  ، infixio, inhæsio.  ، pl.   manubrium ; *cfr.* assyr. qatū, manus.

  canalis.

 ，  ，  ， cachinnatio.

 ،  ，  ， infixus ; defixus, intentus *oculus*.

 ，  ，  ， infixio ; defixio *oculorum*, *mentis*.

 ،  ， contemplatio.

 ，  ， intentus.

 ،  ， cicendula (*gall.* verluisant).

; seu **ׂ** Syrorum littera vigeſima ; littera est lingua-
lis ; quando ; finalis est ei-
præponitur sicut aliis empha-
ticis **ׁ** pro **ׁ** : **ׁ** pro **ׁ** .

1º *Numero valet :* ; = 200 ;
; = 2, 000, 000 ; ; = du-
centesimus.

2º *Æquivalet heb. **ׁ**, ar. **׃** :*
ׁ uterus, heb. **ׁ**, ar.
ׁ.

3º *Permutat c. heb. ; et ar. **ׁ** :*
ׁ filius, heb. **ׁ**, ar. **ׁ** ; it.
c. heb. **ׁ**, cfr. **ׁ** ; **ׁ** vidua,
heb. **ׁ**.

4º *In pluribus radicibus inse-
ritur ; post 1am radicalem
in forma Pa., et ita 2am ra-
dicalem assimilatam disjun-
git, indeque fit forma quadri-
litteralis quam dicunt Parel,*
v. g. : **ׁ** contorsit, æqui-
valens **ׁ** fit **ׁ** impli-
cavit (cfr. ar. **ׁ** et **ׁ**) ; it.
ׁ et **ׁ** volvit.

5º *Excidit a pronuntiatione,
et aliquando a scriptione ; cfr.*

ׁ, st. est. vocis **ׁ** filia ;
ׁ et judæo-aram. **ׁ**,
heb. **ׁ** renes ; cfr. etiam
ׁ et **ׁ** vola ma-
nus.

6º *Tandem facile metathesim
patitur : **ׁ** imper. verbi
ׁ cucurrit ; cfr. etiam **ׁ** ; **ׁ**
et, **ׁ** et **ׁ**.*

ׁ, Rhea stella.
ׁ, virga ; baculus
recurvatus.

ׁ et **ׁ**, ar. رَأْنَد , rheu-
barbarum.

ׁ, v. **ׁ**.

ׁ, species rheubarbari.

ׁ; vox pers., insidiator,
excubitor.

ׁ, ar. رَأْك , substanc-
tia aromatica composita.

ׁ, **ׁ**, arbuscula spi-
nosa.

ׁ ros, aspersio.

ׁ, pro **ׁ**, neo-
gr. δαμασκηνός , piri fructus
(gall. gouache).

ׁ, **ׁ**, aspersio.

ׁ, **ׁ**, mustela.

وَدْدَه , pers. رَاسَخَت , stibium.
وَدْدَه , v. s. دَه .

وَدْدَه et وَدْدَه , وَدْدَه
ράσπινις , rapum planta.
وَدْدَه stultus ; cfr. targum.
دَه id.

وَدْدَه pus ex ulcere manans ;
cfr: δαγη.

لَهْ , v. s. لَهْ .
لَهْ et لَهْ , it. لَهْ , ar. دَه , pl.
لَهْ et لَهْ , pulmo ; it. v.
s. لَهْ .

لَهْ dolor in pulmonibus.
مَهْ vox pers., alumnus.

وَدْدَه et دَه , heb. דָה , ar. دَه ,
fut. دَه crevit, adolevit; multipli-
catus est, magnus factus
est, cfr. دَه ; مُهْ دَه دَه
وَدْدَه ipsum (Christum)
oportet crescere. Part. præs.
وَدْدَه .

Pa. دَه crescere fecit, auxit,
multiplicavit; nutritivit, aluit;
مَهْ دَه دَه ne nutrient
comam; trop. educavit filios,
ar. دَه ; promovit partes seu
factionem alicujus; it. fœne-
ratus est.

Ethpa. دَه دَه pass. ; confor-
tatus est.

Aph. دَه دَه auxit, multiplicavit,
crescere fecit.

وَدْدَه , وَدْدَه auctio, incremen-
tum ; usura.
وَدْدَه id.

وَدْدَه usurarius, ad fœnus per-
tinens.

وَدْدَه , وَدْدَه , v. s. دَه .
وَدْدَه , وَدْدَه , pl. دَه , fœnus,
usura, ar. دَه .

وَدْدَه fœnerator, qui usuram
exerceat.

وَدْدَه auctio, incrementum ;
educatio ; confectio.

وَدْدَه , وَدْدَه auctio, incrementum,
educa-
tio ; german ; trop. alum-
nus.

وَدْدَه nutritor, educator ; f.
وَدْدَه nutrix ; obstetrix ;
educatrix. دَه وَدْدَه ab eo-
dem educatus cum alio, col-
lactaneus.

وَدْدَه , وَدْدَه , st. cst. دَه , heb.
הַרְבֵּה , auctio, incremen-
tum ; trop. educatio, ar. تَعْلِيَةً ;
alumnus. دَه وَدْدَه pæ-
dagogium, gymnasium.

وَدْدَه crevit, inus. in Pe. ; cfr.
وَدْدَه et heb. רְבָבָה , magnus,
multus fuit : it. ut usitat. دَه
strepuit, clamavit.

Palp. دَه دَه , pro inus. دَه ,
auxit ; exaltavit.

Ethpa. سُبْهَةٌ pass. et refl.;
superbavit.

مَحْدَدٌ; clamor, strepitus, tumultus; scutella.

وَهُدًا, et rar. in sing. **وَهُدًى**,
 f. emph. **وَهُدًى** magnus, po-
 tens; major; multus, nimius,
 st. c. **وَهُدًى**, pl. **وَهُدُّى**,
وَهُدًى, **وَهُدًى**, nnq.
وَهُدًى, st. c. **وَهُدًى**, f.
وَهُدًى, **وَهُدًى**, st. c. **وَهُدًى**;

subst., dux, præfектus, prin-
ceps; optimates, magnates;
it. præceptor, magister, *pl.*
حَسْنٌ et حَسْنٌ; *it.* حَسْنٌ, *f.*
حَسْنٌ; *in pl. f.* حَسْنٌ, res
magnificæ, mirabilia. حَكْفٌ

chiliarchus, tribunus militaris : چهارمین سواری را centurio. و همچنان et it. چهارمین سواری را pl. و همچنان چهارمین سواری را paterfamilias, præfector domus, dispensator. چهارمین سواری را et it. چهارمین سواری را øconomia, gubernatio.

تِيْوَنْ *tio domus.* وَقَاتِلٌ *et سَمِلٌ* *præfector, dux militiæ;* وَقَاتِلٌ

Summus Sacerdos. سُمْسَهُ سَقِيرُدُوسُ
الْأَعْلَى Summum Sacerdotium.

وَدْ مَحْمَّـةٌ; et **وَدْ مَحْمَّـةٌ** præfector
coquorum. **وَدْ نَعْمـاً** magnani-

mis. רָבִי, רַבּוֹןִי et רָבָּנִי
Rabbi, Rabboni, magister

meus, præceptor meus ; قَدْرٌ
doctor noster. وَهُوَ مُكْبِرٌ ali-
quid magnum, h. e. grave ;
c. al. adj. superlativum in-
dicat : وَهُوَ أَكْبَرٌ innocentis-
simus ; c. مُكْبِرٌ , major, potentia-
or. وَهُوَ أَكْبَرُ مُكْبِرٌ fratrem
habeo provectiorem me ætate.
وَهُوَ أَكْبَرُ مُكْبِرٌ magnitudo ; princi-
patus ; honor, Dominatio, ti-
tulus honoris Dei vel princi-
pum, ar. وَهُوَ أَكْبَرُ مُكْبِرٌ رُئُوبِيَّةٌ .
Summum Sacerdotium. لَكَبْرٌ
وَهُوَ أَكْبَرُ مُكْبِرٌ splendor. لَكَبْرٌ
وَهُوَ أَكْبَرُ مُكْبِرٌ Dei majestas.
وَهُوَ أَكْبَرُ مُكْبِرٌ multum, valde.

حَدَّتْ, doctor, *raro in sing.*
usurp., *pl. حَدَّتْ*, *v. supra s.*
حَدَّا.

أُولُو الْحِكْمَةِ officium magistri, doctrina.

مَجْمُوعَةٌ magnitudo, magnifica-

اربعمائة، **وَحْمَانًا**، *pl.* **وَحْمَانًا**، *ar.* رَبْوَةٌ، myrias, decem milia, *per extens.*, numerus ingens. **وَحْمَانًا** **وَحْمَانًا** quinquaginta millia. **وَحْمَانًا** **وَحْمَانًا** decem milia paedagogorum. **وَحْمَانًا** **وَحْمَانًا** sexcenta nomina; *it. adv.* **سِبْعَةٌ** **وَحْمَانًا** semel inter decem millia vicium *h. e.* rarissime. **وَحْمَانًا** **وَحْمَانًا** pars ex decem millibus.

﴿وَحْدَهُمْ﴾, pl. ﴿وَحْدَهُمْ﴾ et ﴿وَحْدَهُمْ﴾ inguen ; bubones seu tumores in inguine ; radices femoris ; testiculi.

﴿وَهُوَهُمْ﴾, emph. ﴿وَهُوَهُمْ﴾ augmen- tum ; multitudo.

﴿وَهُوَهُمْ﴾ multum, valde.

﴿أَلْهَمْ﴾ elatio, superbia.

﴿وَهُدْهُمْ﴾, ar. بَرْبَرْ, succus planta- rum decoctione spissatus.

﴿مَنْدَهُمْ﴾ limen ; portula.

﴿وَجْهْ﴾, ﴿خَبْدِيَّ﴾, virgula. ﴿جَبْرِ﴾, virga ferrea.

﴿وَهُدْهُمْ﴾ vox pers., vulpes.

﴿وَهَدْهُمْ﴾, fut. نَفَاهُمْ corruptus est, putruit ; defecit. Part. præt. حَسْنَهُ in pulverem re- solutus ; subst. pulvisculus.

Ethpe. ﴿وَهَدْهُمْ﴾ putridus factus est.

Aph. ﴿وَهَدْهُمْ﴾ corrupit, consumpsit.

﴿وَهَدْهُمْ﴾ corruptio, putrefac- tio ; pulvis, subtilior pulvis, atomus ; it. lucrum, questus, ar. رَبَاحْ.

﴿وَهَدْهُمْ﴾ corruptus, putridus.

﴿وَهَدْهُمْ﴾, fut. ﴿وَهَدْهُمْ﴾ intumuit, inflatus est ; cfr. ar. زَبَانَة pin- guedo.

Ethpe. ﴿وَهَدْهُمْ﴾ intumuit.

Pa. ﴿وَهَدْهُمْ﴾ intumesco fecit.

Part. pass. ﴿لَحْمَهُمْ﴾; inflatus.

Ethpa. ﴿لَهْلَهْ﴾ inflatus est.

﴿وَهَلْهَلْ﴾ tumor ; it. filamentum palmæ.

﴿وَهَلْهَلْ﴾ tumor.

﴿وَهَلْهَلْ﴾ ut ﴿وَهَلْهَلْ﴾, v. s. .

﴿مَنْدَهُمْ﴾ tumor.

﴿وَهَمْهَمْ﴾, v. s. .

﴿وَهَنْهَنْ﴾, v. ibid.

﴿رَبِيزْ﴾ heb. ربֵיזׁ et ar. رَبِيزْ

﴿رَبِيزْ﴾ fut. ربֵיזׁ recu- buit, procubuit ; trop. incu- buit rei, c. رَبِيزْ .

Aph. حَدَّهُ recumbere fecit ; it. denom. c. al. deriv. v. rad. seq.

حَدَّهُ cubatio ; cubile. حَدَّهُ cubile ; locus ubi recumbitur.

﴿مَنْدَهُمْ﴾, pl. ﴿مَنْدَهُمْ﴾ mons.

﴿مَنْدَهُمْ﴾ مَنْدَهُمْ uterus, vulva.

﴿مَنْدَهُمْ﴾ ut seq.

﴿مَنْدَهُمْ﴾ مَنْدَهُمْ cubile.

﴿أَوْهَدْهُ﴾ st. abs. cum nom.

fem. usurpat., heb. אֲרַבְּעַת, ar. أَرْبَعَة, st. emph. أَوْهَدْهُ,

c. nom. masc. usurp., heb. أَرْبَعَة, ar. أَرْبَعَة, quatuor, f.

emph. أَوْهَدْهُ, st. cst. أَوْهَدْهُ, pl. أَوْهَدْهُ مَنْدَهُمْ ; أَوْهَدْهُ

quatuor venti. سَتَهُمْ أَوْهَدْهُمْ vel

أَوْهَدْهُمْ aut abs. أَوْهَدْهُمْ

quadrupedes ; c. أَوْهَدْهُمْ

suff. ۵۰۰ أَوْحَدَهُمْ quatuor eorum. أَوْحَدَهُنَّ , أَوْحَدَهُنَّ , et usitat. in forma contr. ; أَوْحَدَهُنَّ m. quatuordecim, f. أَوْحَدَهُنَّ , raro أَوْحَدَهُنَّ ; أَوْحَدَهُنَّ quadringenti; substant. in st. abs. fem. et in st. emph. f., feria quarta. أَوْحَدَ حِمْرًا dies quarta hebdomadæ. أَوْحَدَهُنَّ dies quarta mensis. حِمْرًا أَوْحَدَهُنَّ die decima quarta mensis. أَوْحَدَهُنَّ vel قُسْطَى أَوْحَدَهُنَّ quatuor cœli partes.

أَوْحَدَهُنَّ ئَمَّا aetas quatuordecim annorum ; numerus quatuordecim.

أَوْحَدَهُنَّ quadraginta.

أَوْحَدَهُنَّ v. denom., fecit ut quatuor essent, ad numerum quaternum auxit.

أَوْحَدَهُنَّ nomen mensuræ liquidorum, metreta.

أَوْحَدَهُنَّ pars quarta, quadrans.

أَوْهَدَهُنَّ id. ; quadrilateralis.

أَوْحَدَهُنَّ tympanum quadratum, sistrum ; it., herba verna, adj. vernus ; أَوْهَدَهُنَّ pluvia vernalis.

أَوْهَدَهُنَّ mensis tertius et quartus anni Moslemorum, ar.

رَيْبَمُ الْثَّانِي et رَيْبَمُ الْأَوَّل .

أَوْهَدَهُنَّ quartus, quadruplex.

أَلِيسْ كُفَّةٌ alis quatuor instructa avis.

أَوْحَدَهُنَّ numerus quaternarius.

أَوْحَدَهُنَّ quadragesimus ; quadragesimalis.

أَوْحَدَهُنَّ numerus quadraginta ; quadragesimale tempus.

أَوْهَدَهُنَّ f., vas quadrilaterum, mactra.

أَوْهَدَهُنَّ pl. قَهْمَهُنَّ paropsis.

أَنْتَ , مَنْهُنَّ v. s. .

أَوْهَدَهُنَّ , fut. بَخْمَهُ compressit, depressit; conculeavit, coarc-tavit, oppressit; gramm., litteram vocali (↑) instruxit; it. abundantius irrigavit ter-ram, neo-ar. زَبَصَ .

Ethpe. أَوْهَدَهُنَّ pass. ; it. ascen-dit.

Pa. أَوْهَدَهُنَّ coarc-tavit; cohibuit, coer-cuit.

Ethpa. أَوْهَدَهُنَّ pass.

أَوْهَدَهُنَّ depression, oppressio; gramm., vocalis (↑), quæ soni depressione emittitur.

أَوْهَدَهُنَّ depressio, conculatio.

أَوْهَدَهُنَّ status rei depressæ; tremor febrilis ; it. protube-rantia oculorum.

أَوْهَدَهُنَّ atrium.

أَوْهَدَهُنَّ tritura frumenti.

لَّجْ وَ et sc̄pius لَّجْ وَ, fut.
 لَّجْ وَ humidus factus est,
 irrigatus est. Part. pr̄ter.
 لَّجْ وَ, لَّجْ وَ; humidus, mollis,
 tener.
 Pa. لَّجْ وَ; humectavit, molli-
 vit; trop. lenivit.
 Ethpa. لَّجْ وَلِ madefactus est;
 germinavit.
 Aph. لَّجْ وَ humidum fecit; per
 extens., florentem, fertilem
 reddidit; it., ar. لَّجْ وَ, spera-
 vit.
 لَّجْ وَ mollities, teneritas,
 viriditas.
 لَّجْ وَ humectans.
 لَّجْ وَ latus, largus, ar. لَّجْ وَ
 id.
 لَّجْ وَ, ar. رَجْب, septimus men-
 sis anni lunaris apud Mosle-
 mos.
 لَّجْ وَ lutum putei.
 لَّجْ وَ, fut. لَّجْ وَ desideravit,
 optavit; impers. لَّجْ وَ وَ لَّجْ وَ et
 لَّجْ وَ desideravi. لَّجْ وَ لَّجْ وَ
 لَّجْ وَ desiderio flagravi,
 valde desideravi. Part. act.
 لَّجْ وَ, لَّجْ وَ et لَّجْ وَ, pl. لَّجْ وَ
 et لَّجْ وَ; impers. لَّجْ وَ لَّجْ وَ
 mihi placuit, cupivi. Part.
 pass. لَّجْ وَ optatus; adj.,
 لَّجْ وَ

لَّجْ وَ, et c. l prosth. لَّجْ وَلِ,
 pulcher, pr̄clarus; it. act.
 appetens, desiderans; emph.
 et subst. لَّجْ وَ; et لَّجْ وَلِ,
 pl. لَّجْ وَ voluptas, cupiditas.
 Pa. لَّجْ وَ desiderare fecit.
 Palp. لَّجْ وَ desiderium exci-
 tavit, cupiditatem movit; al-
 lexit, oblectavit.
 Ethpalp. لَّجْ وَلِ pass.; cupi-
 ditate flagravit.
 Aph. لَّجْ وَ ut Palp.
 لَّجْ وَ, emphat. لَّجْ وَ, st. c.
 لَّجْ وَ desiderium, concupis-
 centia, cupido, delectatio;
 حُسْنَةٌ concupiscentia car-
 nalis.
 لَّجْ وَ cupiditas.
 لَّجْ وَ suavitas, pulchritudo.
 لَّجْ وَ desiderans, appetens;
 appetitiva vis.
 لَّجْ وَ, لَّجْ وَ et لَّجْ وَ cupid-
 itas; libidinosus.
 لَّجْ وَ وَ لَّجْ وَ cupiditas.
 لَّجْ وَ وَ لَّجْ وَ cupidus, ut
 لَّجْ وَ.
 لَّجْ وَ suavitas, voluptas.
 لَّجْ وَ paropsis.
 لَّجْ وَ, fut. لَّجْ وَ, heb. لَّجْ وَ
 iratus fuit, c. لَّجْ وَ pers.; cum
 لَّجْ وَ, se avertit a. Part. pr̄et.
 لَّجْ وَ iratus.

Aph. اَنْفَرَى exacerbavit, ad iram provocavit.

Ethpa. اَنْفَرَى ira percitus est.

اِنْفَرَى indignatio, ira, poena a Deo inficta, *cfr. heb.* רָגֵז *neo-ar.* رَجَزْ ; رَجَزْ iracundus.

اِنْفَرَى indignatio.

اِنْفَرَى iram excitans.

اِنْفَرَى ira.

اِنْفَرَى iracundus.

اِنْفَرَى ira, indignatio.

اِنْفَرَى, pl. اِنْفَرَاتَى, it. اِنْفَرَاتَى, heb. رَاجِلٌ, saccus ; sporta.

اِنْفَرَى ad iram provocans.

اِنْفَرَى iracundia.

اِنْفَرَى, fut. اِنْفَرَى fortiter tetendit arcum.

اِنْفَرَى f., pl. اِنْفَرَاتَى et اِنْفَرَاتَى, heb. رَاجِلٌ, ar. رَجُل pes; *per extens.*, ima pars, radix, basis; *trop.* vestigium.

اِنْفَرَى stapia (*gall.* étriers). اِنْفَرَى مَكْتَبَةٌ velocibus pedibus: magnis itineribus.

اِنْفَرَى filia quæ nascendo te proxime subsecuta est.

اِنْفَرَى leontopodium *planta*; *adv.* اِنْفَرَى in vestigio ejus, post eum. اِنْفَرَى pedibus venit. اِنْفَرَى مَرْجَعٌ rectus stetit.

Ethpe. اَنْفَلَى v. denom., pedibus ivit, *cfr. ar.* رَجَل .

Aph. اَنْفَلَى id.

Schaph. اَنْفَنَى pede trusit, supplantavit, *inde labi fecit*, induxit in malum, c. اِنْفَلَى, vel اِنْفَلَى; it. cohibuit; *cfr. neo-ar.* شَرَكَ supplantavit.

Eschaph. اَنْفَدَى pass; illaqueatus, implicatus est; lapsus est; بِلَى نَمَّةٌ فَكَمْ ne alienis occupationibus distrahantur. مَهْمَّةٌ فَكَمْ حَمَّصَةٌ وَمَتَّا in feminarum commercium collapsi.

اِنْفَلَمَ pedibus.

اِنْفَلَمَ pedes, ar. رَاجِل (gall. piéton, fantassin); in pl. اِنْفَلَمَ pedites, copiae pedestres.

اِنْفَلَمَ pedes, cursor.

اِنْفَلَمَ vallis, fauces montis; it. torrens.

اِنْفَلَمَ et اِنْفَلَمَ, pl. اِنْفَلَمَ, ar. رَجَةٌ, rivus, torrens; stagna aquarum.

اِنْفَلَمَ lapsus: error, culpa, crimen.

اِنْفَلَمَ, ar. رَجَل , olla ænea.

اِنْفَلَمَ, heb. رَجَل , ar. رَجَل , fut. اِنْفَلَمَ, lapidavit.

Ethpe. اَنْفَلَى pass.

Aph. أَفْعَلَ lapidavit.	فَعْلَمْا tumultus; fragor, murmur, <i>pluviae</i> sonus.
أَفْعَلَمْا lapidans.	فَعْلَمْا sentiens, sensibus pollens; sensitivus.
أَفْعَلَمْا lapidatio.	فَعْلَمْا sensibiliter.
أَفْعَلَمْا id; pl. فَعْلَمَاتْ fabae species.	فَعْلَمَاتْ sensibilitas.
أَفْعَلَمْا vel لِمَوْلَى فَرَغْوَسْ, stipedium.	فَعْلَمَاتْ obstetrix.
أَفْعَلَمْا marsupia, cfr. لِلْكَلْمَةْ.	فَعْلَمَاتْ sensibus pollens; sensibus subditus.
أَفْعَلَمْا, vide فَعْلَمْا.	فَعْلَمَاتْ attentus.
فَعْلَمْا, heb. רָגַשׁ, ar. رَجَسْ, fut. فَعْلَمَتْ, strepuit, fremit, tumultuatus est; it. c. fut. فَعْلَمَ sensit, cognovit.	فَعْلَمَاتْ sensibilis.
Part. فَعْلَمَاتْ; act. sentiens.	فَعْلَمَاتْ conscientia rei, testis.
أَفْعَلَمْا eo inscio.	فَعْلَمَاتْ sensus; intelligentia.
Ethpe. أَفْعَلَمْا sensibus perceptus est; commotus est; it. sensit.	فَعْلَمَاتْ ope sensuum, perceptionis viâ.
Pa. أَفْعَلَمْا tumultuari fecit; trop. excitavit; لِمَوْلَى فَخَلَقَ excitavit, seu excogitavit hunc errorem.	فَعْلَمَاتْ et لِمَوْلَى titulus honoris datus officialibus Persarum.
Aph. أَفْعَلَمْا sensit, animadvertisit, c. حَلَّ rei; it. animadverte, sentire fecit. فَعْلَمَاتْ حَلَّ qui perceptit viam crucis seu cui semita crucis sapuit.	فَعْلَمَاتْ, fut. فَعْلَمَ incessit, ambulavit; cucurrit, cursum complevit; profectus est, iter fecit; fluxit, abiit; navigavit, absol. vel seq. حَفَّا trans., incitavit; instituit, castigavit. حَلَّ نَفْعَهُ حَلَّ semetipsum exercuit in re aliqua.
Part. præs. act. لِمَوْلَى, Part. præt. pass. لِمَوْلَى, in stat. abs., tumultus. فَعْلَمَاتْ حَلَّ prima diei aurora.	فَعْلَمَاتْ præs. act. لِمَوْلَى, in stat. abs., tumultus. فَعْلَمَاتْ حَلَّ pass.; immissa est aqua.

Pa. فَوْبَهْ reduxit.

Aph. فَوْبَهْ fluere fecit, immisit, effudit; castigavit. *Part. act.* نَحْدَهْ مَذْهَبًا سُخْمَتَهْ ; مَذْهَبًا , مَذْهَبًا fons emittens sapientiam : sapientiae fons. هَمْنَهْ وَمَذْهَبًا hæmorrhissa ; *adverb.* مَذْهَبًا لَّا وَهَدْهَا تَسْتَشْ v. *infra.*

مَذْهَبًا incessus, cursus ; fluxus ; in *pl.* مَذْهَبًا fluctus.

مَذْهَبَهْ caste.

مَذْهَبًا institutio, disciplina ; c. الْ إِلَمْ ignorantia.

مَذْهَبَهْ fluens ; erudiens, castigator, præceptor.

مَذْهَبَهْ saliva.

مَذْهَبَهْ , الْمَذْهَبَهْ , pl. مَذْهَبَهْ cursus ; castigatio ; disciplina, institutio, eruditio, doctrina.

مَذْهَبَهْ أَهْمَهْ مَهْمَهْ مَهْمَهْ ubi severitas, ibi disciplina.

مَذْهَبَهْ مَهْمَهْ instituendo, castigando.

مَذْهَبَهْ مَهْمَهْ , pl. مَذْهَبَهْ processus, profectio ; fluxus, cursus, navigatio ; fluxus menstruus ; vulva ; *trop.* modus agendi, opus, conatus.

مَذْهَبَهْ , ap. Nestor. مَذْهَبَهْ , v. s. Aph.

فَوْبَهْ — *Pa.* فَوْبَهْ exuit.

Aph. فَوْبَهْ , expandit.

رَدَهْ et فَوْبَهْ pallium, ar. رَدَهْ ; pl. فَوْبَهْ vestes subtile.

مَذْهَبَهْ , ar. مَرْدَنْ , fusus muliebris.

Ethpe. فَوْبَهْ لَيْ v. *denom.*, convolutus est ; textus est.

فَوْبَهْ , fut. فَوْبَهْ , heb. רַדְהָ , ar. رَدَهْ , insecutus est, prosecutus est ; persecutus est, c. acc. rei vel c. لَهْ , لَهْ vel حَدَهْ ; abegit, propulit ; institut rei. فَوْبَهْ لَهْ لَهْ post aurum noli abire.

Ethpe. فَوْبَهْ لَيْ pass. : persecutionem passus est.

فَوْبَهْ , pl. فَوْبَهْ , et c. ل prosth. فَوْبَهْ , insectatio, persecutio.

فَوْبَهْ persecutor.

فَوْبَهْ persecutio.

فَوْبَهْ رَهْدَهْ دَهْدَهْ نَهْرَهْ , rhododendron, ut فَوْبَهْ .

فَوْبَهْ , fut. فَوْبَهْ insidiatus est, observavit ; exspectavit, se paravit.

فَوْبَهْ insidiae ; exspectatio.

فَوْبَهْ , heb. رَهَبَ , ar. رَهَبَ , tremuit, properavit ; usitat. in part. præt. فَوْبَهْ , فَوْبَهْ ;

pavidus; turbatus; confugiens, celer; *it.* horrendus.

Ethpe. پادیل pavidus fuit, timuit; *it. e.* فرد, formidavit.

Aph. ترسیل terruit, perturbavit.

Saph. تسریح festinavit, pavidus cucurrit; *it. act., ursit,* incitavit. *Part. pass.* تسریح; velox; *f.* تسریح, subst. metrum constans decem syllabis in duo hemistichia aequaliter divisus.

Estaph. ترسیم timore percusus est; timuit, fugit; properavit, praeceps fuit.

تسریم, *emph.* تسریح terror, pavidus clamor, præcipitatio; celeritas.

تمددیل cum pavore.

تمددیل pavor, tremor.

تمددیل pavor, timor; properatio, celeritas.

تمددیل velociter.

تمددیل, تسریح metum injiciens.

تمددیل celeritas; acceleratio.

تمددیل velociter, citius.

تمددیل pignus; arrha, *cfr.* تسریح, gr. ἀρράβων, heb.

تمددیل et ar. عربون.

تسریح per modum arrhæ; inde interim.

تسریح, fut. تسریح, imper. تسریح, sed apud Nestor. تسریح, cucurrit, fluxit; incurrit, irruit, *c. v.*; *c. v. expl.*, تسریح تک cucurrit. *Part. præs.* تسریح; *emph. et subst.*, تسریح *pl.* تسریح cursus aquarum, rivus; aqueductus.

Aph. تسریح currere fecit; incurrere fecit, irruere fecit malum; تسریح لح ایم تسریح eum cito ad patrem misit; *c. v.*, dimisit, liberavit; *it. intrans.*, cucurrit, incurrit.

تسریح et تسریح cursus, fluxus. تسریح مکملیل تسریح cursum vitæ consummavi; تسریح مکملیل cursus siderum. تسریح مکملیل fluxus ventris; *it.* aqueductus, *heb.* רהנירם; gramm., nomen accentus.

تسریح cursus.

تسریح et تسریح cursor.

تسریح bona, spec. mobilia ut pecora etc.

تسریح stadium, hippodromus; trop. mos.

تسریح velociter; breve, concise; summatim.

تسریح accelerare faciens;

subst. cursus, fluxus ; *ap. gramm.*, lineola *supra vel infra litteram posita*, in signum carentiae vocalis, *equivalens fere signo Arabum quod vocant* شَكْوْن et شَوْهَن Hebreorum.

شَكْوْنَةٌ venatio.

شَكْوْنَةٌ ḫ̄n̄ȳn̄, resina, *cfr.* فَمْكُمْ et فَمْكُمْ .

شَكْوْنَةٌ, شَكْوْنَةٌ etc. ḫ̄n̄t̄w̄, rhetor.

شَكْوْنَةٌ ars rhetoris, eloquencia.

شَكْوْنَةٌ rhetorica.

شَكْوْنَةٌ et شَكْوْنَةٌ rhetorius.

شَكْوْنَةٌ et فَمْكُمْ فَمْكُمْ rhetorica.

شَكْوْنَةٌ ḫ̄n̄t̄w̄, ḫ̄n̄t̄w̄, oratorium.

شَكْوْنَةٌ, fut. شَكْوْنَةٌ, putruit.

Aph. شَكْوْنَةٌ putruit, putrescere fecit.

شَكْوْنَةٌ putredo ; it. ærugo.

شَكْوْنَةٌ Romanus ; *per extens.*, miles.

شَكْوْنَةٌ Romæus, Græcus.

شَكْوْنَةٌ jus civitatis romanæ.

شَكْوْنَةٌ romane, latine.

شَكْوْنَةٌ et usitat. شَكْوْنَةٌ, fut. شَكْوْنَةٌ

inebriatus est ; *trop.* exsultavit gaudio. Part. præs. شَكْوْنَةٌ, pl. شَكْوْنَاتٌ, شَكْوْنَاتٌ inebriatus, ebrius ; *trop.* amens, insanus. Part. præt. شَكْوْنَةٌ, شَكْوْنَاتٌ.

Ethpe. شَكْوْنَاتٌ inebriatus est.

Aph. شَكْوْنَاتٌ inebriavit ; it. inebriatus est.

شَكْوْنَاتٌ ebrietas.

شَكْوْنَاتٌ ebrius.

شَكْوْنَاتٌ ebrietas.

شَكْوْنَاتٌ inebrians.

شَكْوْنَاتٌ, fut. شَكْوْنَاتٌ strepuit, clamavit ; tumultuatus est, c. شَكْوْنَاتٌ pers. ; *cfr.* heb. שְׁקֹנֶת id. ; it. institut rei, expetivit, c. شَكْوْنَاتٌ. Part. præs. شَكْوْنَاتٌ, شَكْوْنَاتٌ ; blaterans, vanilous.

Ethpe. شَكْوْنَاتٌ tumultuatus est.

Aph. شَكْوْنَاتٌ strepere fecit ; vociferatus est.

شَكْوْنَاتٌ strepitus, vociferatio ; tumultus, contentio.

شَكْوْنَاتٌ vociferans.

شَكْوْنَاتٌ strepitus.

شَكْوْنَاتٌ tumultus, *cfr.* حَمْدَةٌ .

شَكْوْنَاتٌ et شَكْوْنَاتٌ, v. s. شَكْوْنَاتٌ .

شَكْوْنَاتٌ ḫ̄d̄s̄, rosa.

شَكْوْنَاتٌ, v. s. شَكْوْنَاتٌ .

رَهْدَافْنَةٌ رَهْدَافْنَةٌ , rhodo-daphne, *ut* رَهْدَافْنَةٌ .

۱۰۹ , fut. لَتَّا lætatus est, exsultavit; *trop.* floruit *plan-ta*, prosperavit *res*. Part. *præs.* لَتَّا , لَتَّا gaudio ges-tiens ; florens. حَلَّمَتْ لَوْلَى لَتَّا مَحْمَدَتْ viris illustribus urbs florebat.

Aph. لَتَّا exhilaravit.

لَتَّا exsultatio.

لَتَّا exsultans.

سِرْفُ , fut. سِرْفَspiravit, res-piravit, *cfr.* سِرْفَ .

Ethpe. سِرْفَ olfactus est.

Pa. سِرْفَ respirare fecit ; recreavit, placavit.

Ethpa. سِرْفَ pass.; *trop.* re-contentus fuit.

Aph. سِرْفَ odoratus est ; odo-rare fecit.

سِرْفَ مَسْنَدٌ , pler. f., pl. سِرْفَ et مَسْنَدٌ , heb. רָוחַ , ar. رُوحٌ , halitus, spiritus, ventus ; anima, mens ; spiritus incor-poralis, malus spiritus. سِرْفَ مَسْنَدٌ Spiritus Sanctus.

أَفْسَدَ مَسْنَدٌ et مَسْنَدٌ نَفْسَهُ se excusavit. سِرْفَ مَسْنَدٌ ventus urens. سِرْفَ مَسْنَدٌ longanimitas.

سِرْفَ مَسْنَدٌ et مَسْنَدٌ , pl. سِرْفَ مَسْنَدٌ , nnq. سِرْفَ مَسْنَدٌ spiritualis.

سِرْفَ مَسْنَدٌ spiritualiter.

سِرْفَ مَسْنَدٌ et مَسْنَدٌ spiritualitas.

Ethpalan سِرْفَ لِ v. denom., animo desideravit.

سِرْفَ مَسْنَدٌ et مَسْنَدٌ , ar. رَيْحٌ , halitus, aura ; it., ar. رَائِحةٌ , odor.

سِرْفَ مَسْنَدٌ , ar. رَيْحَانٌ , ocimum. myrtus.

سِرْفَ مَسْنَدٌ , pl. سِرْفَ مَسْنَدٌ exhalatio, odor.

سِرْفَ مَسْنَدٌ odorifer, odoratus.

سِرْفَ مَسْنَدٌ exhalatio, odor.

سِرْفَ مَسْنَدٌ olfactio ; aromaticum.

۱۱۰ , heb. رُوحٌ , fut. سِرْفَ am-plus factus est ; spatirosus fuit ; *impers.* كَسِيرَةٌ spatum mihi est : liber sum. Part. *præt.* سِرْفَ مَسْنَدٌ ; amplius ; c. سِرْفَ , liber a re ; it. flans, *cfr.* سِرْفَ ; f. سِرْفَ , ap. gram. vocali مَسْنَدٌ ; notata littera (ة) .

Pa. سِرْفَ ampliavit ; liberavit ; recreavit.

Ethpa. سِرْفَ لِ pass. ; liberata est mater a partu.

Aph. سِرْفَ ampliavit, dilatavit ; levavit, recreavit.

۱۰۵ ; emph. אֹוֹסֶדֶן et
۱۰۶ ; heb. רָוַחַת, recreatio,
levatio, gaudium ; gramm.
۱۰۷ ; nomen puncti ap. Ori-
entales, vocalis munere fun-
gentis et litteræ (o) supra-
scripti, quæ sono (o) res-
pondet.

۱۰۸ pl. ۱۰۹ , emph.
۱۱۰ , pl. ۱۱۱ , ar.
۱۱۲ , flabellum.
۱۱۳ ; amplitudo.

۱۱۴ , inus. — Pa. ۱۱۵ ; commo-
vit.

Ethpa. ۱۱۶ pass. ; deflexit,
nutavit, c. ۱۱۷ .

۱۱۸ deflexio, vacillatio.

۱۱۹ id.

۱۲۰ rami populi aut salicis.
۱۲۱ , v. ۱۲۲ .

۱۲۳ , fut. ۱۲۴ altus fuit ;
intumuit, cfr. heb. ۱۲۵ et ar.
۱۲۶ .

Ethpe. ۱۲۷ pass. exaltatus est ;
se extulit ; superbivit, c. ۱۲۸ ;
sublatus est, abolitus est.

Pa. ۱۲۹ exaltavit, usit. in
part. pass. ۱۳۰ ; altus, ex-
celsus.

Aph. ۱۳۱ pass. sustulit ; exaltavit ;
subtraxit, abolevit, suppres-

sit, negavit ; eripuit a malo,
c. ۱۳۲ ; it. destillavit. ۱۳۳ caput ejus elevavit :
constituit eum in dignitate.
۱۳۴ id. Part. act.
۱۳۵ . Part. pass.
۱۳۶ ۱۳۷ ; ۱۳۸ ; ۱۳۹ interdictus a re.

Palp. ۱۴۰ erexit ; trop. exal-
tavit, extulit.

Ethpalp. ۱۴۱ pass.

۱۴۲ altitudo, elevatio ; collis.

۱۴۳ altitudo. ۱۴۴ elevatio
capitis : solatium.

۱۴۵ verbum, v. s. ۱۴۶ .

۱۴۷ lapis magnus.

۱۴۸ altus ; trop. superbus.

۱۴۹ jactabundus ; ۱۵۰

۱۵۱ collo erecto : cum magna
superbia ; subst. cisterna ; f.
emph. et subst. ۱۵۲ , pl.
۱۵۳ collis, mons.

۱۵۴ superbia, arrogantia.

۱۵۵ vel ۱۵۶ bdellium,
species suffimenti.

۱۵۷ , pl. ۱۵۸ rheu-
ma.

۱۵۹ exaltatio ; gloria, de-
cus.

۱۶۰ , heb. ۱۶۱ , altitudo.

۱۶۲ altus, exaltatus.

۱۶۳ apud gramm., negati-
vus.

مَهْمَدَةً exaltatio ; oblatio ; negatio.

مَهْمَدُ exaltatus.

مَهْمَدَةً evectio, exaltatio.

مَهْمَدَةً sublimiter.

فَمَهْمَدَنْ, v. s. فَمَهْمَدَنْ .

غَرَّ, fut. مَهْمَدَنْ garrisit, blateravit ; cfr. הַדְרִת, Hiph. v. inus.

רוּץ, tumultuavit. Part. غَرَّ.

غَرَّتْ garritus ; cfr. heb. רָעֵן clamor.

مَهْمَدَةً nugae.

فَمَهْمَدَنْ f., malva.

فَمَهْمَدَنْ , spuma v. s. فَمَهْمَدَنْ .

فَمَهْمَدَنْ حَوْضَةً, momentum.

فَمَهْمَدَنْ ut قَرْ q. v.

فَمَهْمَدَنْ , v. s. فَمَهْمَدَنْ .

فَمَهْمَدَنْ saliva, cfr. فَمَهْمَدَنْ ; it. cerebrum.

فَمَهْمَدَنْ v. s. فَمَهْمَدَنْ .

فَمَهْمَدَنْ ptisana, ferculum e lacte et hordeo paratum (ar. كِشْكَ).

فَمَهْمَدَنْ elitellæ.

لَمْ, id. q. لَمْ commotus est.

نَارَقَهْمَدَنْ nares.

هَارَمَهْمَدَنْ ρύθμος, harmonia, rythmus.

سَمَهْمَدَنْ simus.

لَمْ inus., cfr. heb. רֹזֶה, emaciavit.

Ethpe. فَمَهْمَدَنْ emaciatus est, tabuit.

فَمَهْمَدَنْ et فَمَهْمَدَنْ defluvium.

لَمْ, it. فَمَهْمَدَنْ et فَمَهْمَدَنْ , pl. فَمَهْمَدَنْ , pers. رَاز, secretum ; mysterium, symbolum ; sacramentum ; Sacramentum Eucharistiae.

حَتَّى فَمَهْمَدَنْ , pl. فَمَهْمَدَنْ , secreti conscientius ; conjurator ; mysteriorum particeps ; sanctæ communionis particeps. فَمَهْمَدَنْ سَعْدَمْ حَمَّدَنْ vel سَعْدَمْ حَمَّدَنْ فَمَهْمَدَنْ Feria quinta in Cœna Domini ; adverb. فَمَهْمَدَنْ et فَمَهْمَدَنْ secundum typum ; sicut.

Ethpe. فَمَهْمَدَنْ v. denom., secreti particeps fuit, conjuravit ; in animo statuit ; significatus est. فَمَهْمَدَنْ مَهْمَدَنْ simul conspirationem moliti sunt.

Pa. فَمَهْمَدَنْ secretum cognovit ; significavit.

Ethpa. فَمَهْمَدَنْ mysteriis initatus est.

Aph. فَمَهْمَدَنْ symbolice locutus est ; significavit.

Ethpailan et Ethpalan فَمَهْمَدَنْ et فَمَهْمَدَنْ secreto confabulatus est.

فَمَهْمَدَنْ mystice, allegorice.

فَمَهْمَدَنْ natura mystica, mysticismus.

فَمَهْمَدَنْ mysticus, allegoricus.

فَمَهْمَدَنْ secretum.

مَلَّا فَوْنَامَا	mystagogus.	فَسْتَا	molarum structor.
مَلَّا فَوْنَامَا	secretum.	فَسْتَا	molaris.
فَوْهَاتْنَا vox pers., رَوْزَيَانَ , exse- cutor.		فَمَسْتَهُ	, c. suff. 3 ^o pers. f.
فَأَحْدَهَا radix vitis.		فَسَعَدَهَا	, fut. فَسَعَدَهَا , c. suff.
فَأَبْلَهَا tunica linea diaconi.		فَسَعَدَهَا	et فَسَعَدَهَا ,
فَأَرْجَهَا et لِيْهُ , pers.-ar. أَرْجَهَ et لِيْهُ , oryza (gall. riz).		امَّا فَسَعَدَهَا	amavit, dilexit; cupivit. Part.
فَأَفْلَهَا , fut. فَأَفْلَهَ sparsit, con- spersit ; stillavit, effudit ; cfr. أَوْفَ et ar. ذَرَف id.		فَسَعَهُ	act. فَسَعَهُ , c. suff.
Ethpa. فَأَفْلَهَا pass.		فَسَعَهُ	فَسَعَهُ ; subst., dilec-
Aph. فَأَفْلَهَا effudit.		فَسَعَهُ	tus. فَسَعَهُ حَمَدَا domiseda.
فَأَفْلَهَا et فَأَفْلَهَا adspersio, effusio ; effluvium ; trop. فَأَفْلَهَا non attigit vestem respersio corruptionis ; it. dolor, angustiae, in pl. فَأَفْلَهَا soleæ sandalii.		فَسَعَهُ	pecuniæ amato- res, Christi ama-
فَأَفْلَهَا , v. s. l.		فَسَعَهُ	tor. Part. pass. فَسَعَهُ ,
فَأَفْلَهَا , pers. دَارِيَقَ et ar. دَارِيَقَ , texturæ genus.		فَسَعَهُ	nnq. فَسَعَهُ ; amabilis ; gra-
فَأَفْلَهَا , vox ar. رَزْقَنَ , commea- tus.		فَسَعَهُ	tus. دَكَمَهَا دَكَمَهَا quod ei placebat.
فَأَفْلَهَا situla.		فَسَعَهُ	Ethpe. فَسَعَهَا amatus est, di-
فَأَفْلَهَا , pers.-ar. رَسْتَاقَ , sub- urbia (gall. banlieue) ; trac- tus, provincia, regio.		فَسَعَهُ	lectus est.
فَسَنْتَا et فَسَنْتَا f., pl. فَسَنْتَا et فَسَنْتَا , ar. رَحَّا , lapis molaris.		فَسَعَهُ	Pa. فَسَعَهُ indulsit, misertus est, c. فَسَعَهُ pers., ar. رَحَّا .
Ethpalpal. فَسَنْتَا v. den., in gyrum rotavit lapis molæ.		فَسَعَهُ	Ethpa. فَسَعَهَا misericordia motus est, c. فَسَعَهُ .
		فَسَعَهُ	Emph. فَسَعَهَا , dilectio, amor, caritas ; benignitas.
		فَسَعَهُ	فَسَعَهَا dilectio, amicitia.
		فَسَعَهُ	فَسَعَهَا id.
		فَسَعَهُ	فَسَعَهَا , f. فَسَعَهَا amans, ama-
		فَسَعَهُ	tor, amicus.
		فَسَعَهُ	فَسَعَهَا amanter.
		فَسَعَهُ	فَسَعَهَا amore flagrans.
		فَسَعَهُ	فَسَعَهَا , f. فَسَعَهَا amatus, di-
		فَسَعَهُ	lectus.
		فَسَعَهُ	pl. فَسَعَهُ , heb. فَسَعَهُ , ar.

جَمْرٌ, uterus, vulva, viscera ;
it. heb. רַחֲמִים, spec. in pl.,
amor intimus ; misericordia,
gratia. سُفْدَى لِّلْ سُفْدَى, sine clemen-
tia, crudeliter.

سُفْهَى, f. سُفْهَى مِسِّرَادُورْ miserator ;
dilector ; pl. f. سُفْهَى مِسِّرَادِيْر misericorditer.

سُفْهَى مِسِّرَادَا miserica-
cordia.

سُفْهَى مِسِّرَادُورْ valde misericors.

سُفْهَى مِسِّرَادَا إِتْ سُفْهَى مِسِّرَادَا misericors ;
misericorditer.

سُفْهَى مِسِّرَادَا مِسِّرَادِوس miserors ;
miserator Deus.

سُفْهَى مِسِّرَادَا comiter.

سُفْهَى مِسِّرَادَا مِسِّرَادَا misericordia ; gratia,
caritas ; eleemosyna, pl.
سُفْهَى مِسِّرَادَا ; it. titulus honoris :
سُفْهَى مِسِّرَادَا gratia vestra.

سُفْهَى فَتَّ, fut. سُفْهَى insedit ;
cfr. heb. כָּרֵד, hue illuc mo-
tus est.

Pa. سُفْهَى alas agitavit avis, cir-
cumvolvitavit; incubuit, illaps-
sus est c. حَلَّ ; trop. fovit, mi-
sericoadia complexus est ; it.
transit., incubare fecit, illabi-
fecit ; imposuit manus super
sacrificium, super caput ; ab-
sol., consecravit ; ordinavit.

سُفْهَى كَمَا incubatio.

سُفْهَى الْ أَلَارُومْ alarum agitatio ; incu-

batio, illapsus ; trop. actus
fovendi, misericordia.
سُفْهَى, سُفْهَى mitis, clemens,
misericors.

سُفْهَى, ar. رَضْفَى, lapis ignitus
quo injecto lac calefit.

سُفْهَى مِسِّرَادِيْر fovens, misericors, mi-
serator.

سُفْهَى مِسِّرَادَا elementia.

سُفْهَى فَتَّ, inus. in Pe., cfr. heb.
קְרַחַ, et ar. دَرْجَقَ, remotus fuit.

Ethpe. سُفْهَى لِّا et Ethpa. لِّا سُفْهَى procul fuit ; discessit, reces-
sit.

Aph. سُفْهَى آمُوتْ amovit, removit,
elongavit, repulit ; it. se amo-
vit, discessit.

سُفْهَى distantia ; longinquitas ;
adverb. سُفْهَى, it. حَلَّ سُفْهَى a longinquo, procul ; حَلَّ سُفْهَى procul, in longinquum.

سُفْهَى discessio.

سُفْهَى كَمَادَا prohibition.

سُفْهَى سُفْهَى remotus, longin-
quus, distans.

سُفْهَى سُفْهَى distantia, longinquitas.

سُفْهَى سُفْهَى amovens.

سُفْهَى سُفْهَى dimissorius.

سُفْهَى سُفْهَى remotio ; defectus.

سُفْهَى سُفْهَى distans, ab alio distinctus : in poesi,
metri nomen constans sexde-

cim syllabis in duo hemistichia æqualiter divisis.
فٰتْهٰ separatio, discessio; defectio, rebellio; abstinentia.

فٰتْهٰ, fut. **فٰتْهٰ سَمَّا** serpsit, repsit; se movit. Part. præs. **فٰتْهٰ**; emph. et subst. **فٰتْهٰ**, ut **فٰتْهٰ**.

Aph. **فٰتْهٰ** repere fecit; progenuit; trop. suggestit cogitationes, movit; cupivit.

فٰتْهٰ سَمَّا reptatio. **فٰتْهٰ سَمَّا** erosio dentium, caries.

فٰتْهٰ سَمَّا reptile, et coll. **فٰتْهٰ سَمَّا** reptilia; it. insecta, ar. حشرة; in pl. pustulæ parvæ ex calore exortæ.

فٰتْهٰ سَمَّا dimin., animalculum.

فٰتْهٰ سَمَّا, f. **فٰتْهٰ سَمَّا**, f. pl. **فٰتْهٰ سَمَّا** reptile.

فٰتْهٰ سَمَّا, pl. **فٰتْهٰ سَمَّا** id.

فٰتْهٰ سَمَّا muscus aquaticus (*gall. mousse*); pl. **فٰتْهٰ سَمَّا** reptilia.

فٰتْهٰ سَمَّا myrobalsamum.

فٰتْهٰ *inus.*-Aph. **فٰتْهٰ** irriguit, contempsit, c. **كَ**.

فٰتْهٰ, fut. **فٰتْهٰ سَمَّا**, heb. **בַּתָּה**, ar. رطّب, humidus fuit, maduit.

Ethpe. **فٰتْهٰ** humectatus est.

Pu. **فٰتْهٰ** humectavit.

Aph. **فٰتْهٰ** id.

Ethpa. **فٰتْهٰ** humefactus est.

فٰتْهٰ, et ap. Orient. **فٰتْهٰ**, humor, viriditas; viridis planta. **فٰتْهٰ** humidus; recens, virens, viridis.

فٰتْهٰ, humiditas, humor, humidum. **فٰتْهٰ** وَحْتَنَا humor oculorum.

فٰتْهٰ humectans.

فٰتْهٰ et **فٰتْهٰ**, ar. نطل, libra, pondus; cfr. كُهنا.

فٰتْهٰ et **فٰتْهٰ**, ar. رطان, fut.

فٰتْهٰ mutavit, murmuravit, oblocutus est, c. **كَ** pers. Part. præter. **فٰتْهٰ**; conquerens, c. **كَ**.

Pa. **فٰتْهٰ** id.

Aph. **فٰتْهٰ** ad conquerendum impulit, concitavit, c. **كَ**; it. conquestus est.

فٰتْهٰ murmur, murmuratio, accusatio.

فٰتْهٰ et **فٰتْهٰ** murmur.

فٰتْهٰ murmurans.

فٰتْهٰ accusatio, murmuratio.

فٰتْهٰ ut **فٰتْهٰ**.

فٰتْهٰ **فٰتْهٰ** pro **فٰتْهٰ** διάμετρον, diametrum.

فٰتْهٰ **فٰتْهٰ** ράχη, rhacoma, rheubarbarum.

فٰتْهٰ **فٰتْهٰ** ρίζωμα, radix.

- فَسْ , v. فَسْ .
 فَسْ ocimum, v. *ibid.*
 فَسْ , v. فَسْ .
 فَسْ et فَسْ ḥητην, pers.-ar. رَاتِيَّة , resina ; cfr. فَسْ ; it. *ap. Alchim.*, lithargyri species.
 فَسْ , heb. פַּרְעֹשׂ , ar. فَرَعْشَ , species rhinocerotis *vel* bubali, unicornis.
 فَسْ , pl. فَسْ مَدْهُمْ ḥَرْبَلُخ , verbum. فَسْ مَدْهُمْ ḥَرْبَلُخτικός , verbalis, a verbo derivatus.
 فَسْ eboris scobs, limatura eboris, cfr. gr. ἔρυμα purgamentum.
 فَسْ , ar. رِيفٌ , ripa.
 فَسْ fluminis accola.
 فَسْ vox lat., repudium, libellum repudii.
 فَسْ , corrupt. a δεῖπνον , convivium.
 فَسْ , heb. פִּידֵי , vanum quid.
 فَسْ inanis, vanus.
 فَسْ vanitas.
 فَسْ , ar. فَرْسَ , saliva ; pituita.
 فَسْ , nnq. فَسْ , heb. فَسْ , ar. دَأْس , pl. فَسْ caput ; per extens. cacumen, extremitas, fastigium ; initium, principium, primitiae ; capitulum ; summa rei ; prae-
- ses, dux, princeps. فَسْ أَكْتَرْا Patriarcha. فَسْ compitum. فَسْ præfector. فَسْ Abbas, f. فَسْ بَنْدَهْ اً Abbas, abbatissa. فَسْ dignitas abbatis ; فَسْ aries, balista. فَسْ regis assessor. فَسْ calendæ. فَسْ summus Pontifex. فَسْ fons, origo. فَسْ præses ; episcopus. فَسْ gubernator navi. فَسْ rapum planta. فَسْ كَبِيرًا ecclesiæ præpositus. فَسْ ar. رَأْسُ الْقَيْن , fluminis caput *seu* origo. فَسْ filia magnatis. فَسْ extremum *seu* minimum digitum præcidit. فَسْ præfectus, præpositus erat. فَسْ حَسْنَهَا res præfuit. فَسْ præfecit ; it. condemnavit ; adverb. فَسْ vel et contr. فَسْ principio, de integro, denuo. فَسْ a summo ad imum. Palen فَسْ v. denom., principem creavit.
Ethpal. فَسْ et فَسْ pass.
 فَسْ principaliter.
 فَسْ principatus. فَسْ

summum sacerdotium, pontificatus. **فَمَنَا** archipresbyteratus, pontificium.
فَمَنَّا *dimin.*, extremitas plantae.

فَمَنْ primus, primogenitus; principalis, summus; optimus, pretiosus, insignis.
فَمَنْهَا, *pl.* principium, initium; primitiae; **فَمَنْهَا**, *vel apud Syr. Orient.* **فَمَنْهَا** in principio.

فَمَنَّا antistes, princeps; praesul, Pontifex. **فَمَنْ فَمَنَّا** Summus Pontifex.

فَمَنَّا principatus, pontificatus; **فَمَنْهَا** præses fuit.

فَد, *ar.* **رَكِب**, *fut.* **فَد**, *ar.* **جُمِنَتُ**, *fut.* **فَد**, *c.* **لَه**; **فَد**, **فَد** *vectus est in mare*: navem condescendit (*ar.* رَكِب الْجَر); *c.* **حَمَّ**, *iniit feminam*. *Part.* **پَرَس**, equo insidens; *subst.* **فَهْـ** eques; *it.* superior lapis molæ. *Part.* **پَرَـ**: equitans. **فَـ**, **فَـ** *فَـ* ascendentēs in equis.

Ethpe. **فَـ** inita est femina. *Pa.* **فَـ**, composuit, conjunxit; *sagittam instruxit*; *trop.* instituit; *exegogitavit*.

فَـ *تَـ* prætextus contexuit.
Part. **مَـ**, **مَـ**; *subst.* conjunctio. **مَـ** sermo compositus *h. e.* concisus.

Ethpa. **فَـ** *أَـ* pass.

Aph. **فَـ** ascendere fecit, superimposuit, insidere fecit *equo*; *equum* salire fecit, *c.* **لَـ**; *it.* condescendit *navem*.

Part. pass. **مَـ**, **مَـ**, *f.* **مَـ**, *st. cst.* **مَـ**, *pl.* **مَـ**; *subst. in m. et f.* *emph.*, *ar.* مَـ, *vehiculum*, *currus*; *navis*; *ephippium*; *solium*, *thronus*.

فَـ junctura, vinculum, *pl.* **فَـ** *cursus sideris*.

فَـ coitus.

فَـ, *pl.* **فَـ** jumentum, *ar.* رَكَاب (*gall.* monture); *currus*; *equitatio*, *equitatus*; *equites*; *sedes*, *solium*.

فَـ jumentum.

فَـ scopæ.

فَـ compactio, compositio. **فَـ** constructio phrasis, syntaxis.

فَـ, *pl.* **فَـ** eques.

فَـ equitans, equo insidens.

فَـ compositio. **فَـ** structura membrorum ejus.

فَـ structor, compositor.

مَرْفُعٌ, heb. מָרֵף, ar. مَرْفُعٌ et مَرْفَعٌ fut. مَرْفُعٌ lenis, tener fuit, mollis factus est.

Pa. مَرْفَعٌ lenivit, mollivit; trop. temperavit vim; ap. gramm., molliter seu aspirate pronuntiavit litteram. مَلِئَةً مَرْفَعًا littera molliter pronuntiata.

Ethpa. مَلِئَةً مَرْفَعٌ pass.; trop. مَلِئَةً مَرْفَعٌ حَقْدَمَةً leniter locutus est cum eo.

Aph. مَرْفَعٌ lenivit, mollivit.

Ethpalp. مَرْفَعٌ مَلِئَةً مَرْفَعٌ pass.

مَرْفَعٌ; mollitia.

مَرْفَعٌ lenitas, mollities; apud gramm., lenis pronuntiatio litterarum مَرْفَعٌ, oppos. ad مَهْمَنْتَهُ.

مَرْفَعٌ, مَرْفَعٌ, مَرْفَعٌ, مَرْفَعٌ, مَرْفَعٌ, مَرْفَعٌ, mollis, lenis; tenuis, delicatus; languidus, debilis oculus etc.; subst. panis mollis; sericum.

مَرْفَعٌ leniter; sensim, paulatim.

مَرْفَعٌ lenitudo, mollities, lenitas.

مَهْمَنْتَهُ emolliens.

مَهْمَنْتَهُ mollis.

مَفْلَى; aromatum seu pharmorum confector et vendi-

tor, pharmacopola circumfaranus; cfr. heb. רַכְלָה mercator part. v. רַכְלָה circumivit.

مَفْكَمَةً, ad pharmacopalam vel pharmacopolæ artem pertinens.

مَفْكَمَاءً unguentarii, pharmacopolæ ars.

مَفْلَى, fut. مَفْلَى inclinatus est, inclinavit se; trop. se demisit; illapsus est; inclinavit, declinavit dies, umbra; مَفْلَى حَسْبَمْ يَمْjamjam ad vesperascit.

Ethpe. مَلِئَةً مَرْفَعٌ se inclinavit, c. بِرِيْ rei; trop. se demisit (gall. condescendre). مَنْهَدَهُ مَنْهَدَهُ ut eorum corda flecterentur.

Aph. مَلِئَةً مَرْفَعٌ inclinare fecit; inclinavit, flexit caput etc.; deposit; trop. demisit, temperavit; humiliavit; it. intrans., se inclinavit; declinavit. مَلِئَةً مَرْفَعٌ حَقْةً مَنْهَدَهُ collum inclinavit præceptis: obedivit. Part. pass. مَهْمَنْتَهُ, emph. مَهْمَنْتَهُ; subst., v. infra.

مَهْمَنْتَهُ inclinatio; cantus, concentus; metrum in poesi; murmur aquarum.

flexio.

inclinatus, demissus ;
prostratus.

propensio.

fulerum.

inflexio, curvatio.

placabilis.

c., pl. equus,
equa, pler. collect. usurp.
grex spec. equorum.

ar. زَعْلَةٌ, fut. تُنْهَىٰ
jecit, projecit, dejectit ; effudit ; intr., se effudit ; incubuit rei, c. ت. Part. act. præs. وَهَمْنَىٰ, وَهَمْنَىٰ. Part. pass. præter. وَهَمْنَىٰ, absol. وَهَمْنَىٰ et c. l prosth. حَمْنَىٰ أَوْهَمْنَىٰ ; وَهَمْنَىٰ حَمْنَىٰ humi jacens ; impers. c. وَهَمْنَىٰ, وَهَمْنَىٰ sollicitus sum, mihi ipsi curæ est ; statutum est. حَمْنَىٰ وَهَمْنَىٰ حَمْنَىٰ بِسْدَلْمَىٰ a timore forte perculsus es-set. وَهَمْنَىٰ سَهْلًا حُكْمًا حَلَّا أَحْكَمْنَىٰ meretur a Deo retributionem. وَهَمْنَىٰ مَهْمَنْىٰ vocem emisit. وَهَمْنَىٰ مَهْمَنْىٰ مَهْمَنْىٰ quievit. وَهَمْنَىٰ حَمْنَىٰ حَلَّا مَهْمَنْىٰ centum decies repetens, seu multiplicans. وَهَمْنَىٰ سَلَلَ حَلَّا مَهْمَنْىٰ aceto chordas aspergit : incassum loquitur.

Ethpe. وَهَمْنَىٰ pass., se submisit ; consensit, c. ؟ seq. fut. ;

irruit in, c. حَلَّ ; incubuit rei, c. حَلَّ ; it. se opposuit. حَمْنَىٰ حَمْنَىٰ futilium rerum prosecutioni dedit. وَهَمْنَىٰ وَهَمْنَىٰ حَمْنَىٰ ٥٣ qui calumniam passus est.

Ethpa. وَهَمْنَىٰ in errorem inductus est.

Aph. أَوْهَمْنَىٰ jecit, projecit, prostravit ; immisit, fudit, effudit ; imposuit pœnas, tributa ; inflexit ; concitavit ; calumnatus est, c. حَلَّ ; intrans. se immisit, irruit, c. حَلَّ ; insecurus est, c. حَلَّ ; it. trop. elegit rem. أَمْنَىٰ أَوْهَمْنَىٰ subscrispsit. وَهَمْنَىٰ viam arripuit : profectus est. أَوْهَمْنَىٰ حَلَّ أَتَرْهَمْنَىٰ stravit asinum suum. أَوْهَمْنَىٰ حَلَّ فَتَالْمَىٰ in eo injecit vincula ferrea : compedibus eum vinxit. أَوْهَمْنَىٰ كَهْمَنْىٰ مَهْمَنْىٰ clysterizavit. أَوْهَمْنَىٰ تَهْمَنْىٰ حَمْنَىٰ prostravit se coram. وَلَا تَهْمَنْىٰ حَمْنَىٰ لَهْمَنْىٰ ne cum enarent effugerent. أَوْهَمْنَىٰ تَهْمَنْىٰ ignem accendit. وَهَمْنَىٰ حَمْنَىٰ حَمْنَىٰ gladio se accinxit. أَوْهَمْنَىٰ aliquem gladio petivit. Part. act. وَهَمْنَىٰ, وَهَمْنَىٰ pl. وَهَمْنَىٰ أَتَرْهَمْنَىٰ subscriptio ; f. emph. et subst. v. infra.

Ettaph. مَتْلَأٌ jactus est ;
fusus est.

مُهْتَدٌ, emph. مَهْدًا projectio,
jactatio ; مَهْدٌ subscriptio.
مَهْدَتْنَا, وَمَهْدَتْنَاهُ id
quod offertur, dos nuptialis ;
collecta ; effusio.

أَمْهَاتْنَاهُ, pl. أَمْهَاتْنَةٌ dos nup-
tialis.

مَهْدِمٌ jaciens, conjiciens, projic-
ciens ; f. مَهْدَمَةٌ, subst. clys-
terium, pl. مَهْدَمَاتٌ.

مَهْدَنْيٌ jaculator ; trop. susurro ;
calumniator, deceptor.

مَهْدَنْيٌ calumniator.

مَهْدَنْيٌ calumnia.

مَهْدَنْيٌ delator.

مَهْدَنْيٌ, pl. مَهْدَنْيٌ missile
(gall. projectile) ; trop. pars
officii divini in liturgia, anti-
phona.

مَهْدَنْيٌ, pl. مَهْدَنْيٌ jactatio ;
fundatio, fundamentum. مَهْدَنْيٌ

مَهْدَنْيٌ a constitutione
mundi.

وَمَهْدَنْيٌ et مَهْدَنْيٌ, v. s. مَهْدَنْيٌ.

وَمَهْدَنْيٌ et مَهْدَنْيٌ, vox ar. رَمَضَانٌ,
nonus mensis jejunio conser-
cratus apud Moslemos.

وَمَهْدَنْيٌ, ar. رَمَزٌ, fut.
et مَهْدَنْيٌ innuit ; per extens.,
significavit, indicavit.

Ethpe. مَهْلَأٌ indicatus est.

Pa. مَهْلَأٌ innuit.

مَهْلَأٌ nutus ; trop. signum, in-
dicatio ; حَمْدَنْيٌ أَكْتَبْرٌ Dei nu-
tu, inspiratione ; ap. gram.,
مَهْلَأٌ وَمَهْلَأٌ pronomen demon-
strativum ; pl. مَهْلَأٌ ئِنْجِيلٌ ænigmata.

مَهْلَأٌ ئِنْجِيلٌ dimin., nutus levis.

مَهْلَأٌ ئِنْجِيلٌ indicativus, signifer ;
apud gram., demonstrativus.

مَهْلَأٌ ئِنْجِيلٌ mystice.

زَنْجٌ f., pl. زَنْجَهَاتٌ, ar. زَنْجٌ,
lancea.

رَمَحٌ, f. وَمَهْدَنْيٌ, heb. רַמָּה, ar.
رَمَحَةٌ, equus, coll. usurpat.,
وَمَهْدَنْيٌ grex equorum ; per ex-
tens., grex quicumque ; ag-
men, turma.

وَمَهْدَنْيٌ gregalis.

وَمَهْدَنْيٌ pastor vel possessor gregis.
مَهْدَنْيٌ forceps quo resecatur
ellychnium.

وَمَهْدَنْيٌ, et deriv. v. s. مَهْدَنْيٌ.

وَمَهْدَنْيٌ tinea.

وَمَهْدَنْيٌ, ar. رَمَانٌ, malus punica.

وَمَهْدَنْيٌ وَمَهْدَنْيٌ prunus arme-
niaca (gall. abricot). مَهْدَنْيٌ

وَمَهْدَنْيٌ centaurium planta.
وَمَهْدَنْيٌ وَمَهْدَنْيٌ papaver, opium.

وَمَهْدَنْيٌ quietus ; mollis, lenis,
mitis ; longanimis, sapiens.

لِئَنْتَ مَهْمَهْمَةً ; lenitas ; longanimitas, mansuetudo ; prudentia.

Ethpe. لِئَنْتَ مَهْمَهْ مَهْمَهْ v. *den.*, mollis fuit, se polluit.

لِئَنْتَ مَهْمَهْمَةً ; constanter, prudenter, longanimiter.

لِئَنْتَ مَهْمَهْمَةً وَهُمْهُمْ ignis sub cinere reconditus.

أَلْهَمْرَا , ar. رَمْصَ , albugo oculi. لِئَنْتَ مَهْمَهْ , v. s. وَهُمْهُمْ .

لِئَنْتَ مَهْمَهْ , fut. لِئَنْتَ مَهْمَهْ vespertino venit tempore, advesperavit ; *inde trop.* præteriit, disparuit, evanuit.

Ethpe. لِئَنْتَ مَهْمَهْ advesperavit.

Pa. لِئَنْتَ مَهْمَهْ vesperam usque com moratus est ; advesperavit.

Aph. لِئَنْتَ مَهْمَهْ *id.*

لِئَنْتَ مَهْمَهْ , مَهْمَهْ vesper, vespertini num tempus. *vel* حَمَّمَةً حَمَّمَةً vespere. مَهْمَهْ مَهْمَهْ occidens, occasus.

لِئَنْتَ مَهْمَهْ vespertinus.

لِئَنْتَ مَهْمَهْ , v. s. وَهُمْ .

لِئَنْتَ مَهْمَهْ , v. s. وَهُمْ .

لِئَنْتَ مَهْمَهْ , ar. رَأَى , fut. لِئَنْتَ مَهْمَهْ meditatus est ; perpendit, consideravit, cogitavit.

Ethpe. لِئَنْتَ مَهْمَهْ cogitatus est, consideratus est.

Ethpa. لِئَنْتَ مَهْمَهْ cogitavit, medita-

tus est, consideravit ; studuit.

Aph. لِئَنْتَ مَهْمَهْ cogitare fecit ; occupatum tenuit, distinuit.

Part. act. لِئَنْتَ مَهْمَهْ ; f. emph. et subst. مَهْمَهْ مَهْمَهْ , pl. مَهْمَهْ مَهْمَهْ , id. q. وَهُمْ .

لِئَنْتَ مَهْمَهْ , c. suff. وَهُمْ et وَهُمْ , cogitatio, cura, studium.

لِئَنْتَ مَهْمَهْ meditans, considerans. لِئَنْتَ مَهْمَهْ meditatio, consideratio, studium.

لِئَنْتَ مَهْمَهْ remus.

لِئَنْتَ مَهْمَهْ , inus. ; cfr. ar. رَسَأَ , quiet vit, substitut.

Aph. لِئَنْتَ مَهْمَهْ , ar. أَرْسَى , appulit navis.

لِئَنْتَ مَهْمَهْ anchora, ar. قَرْسَأَةً .

لِئَنْتَ مَهْمَهْ lixivia.

لِئَنْتَ مَهْمَهْ , pers. رَاسُو , mustela. لِئَنْتَ مَهْمَهْ , pers. رَوْزَبَانْ , septum cancellatum (*gall.* balustrade), cfr. مَهْمَهْ مَهْمَهْ .

لِئَنْتَ مَهْمَهْ ; scrobs in occipitis inferiori parte.

لِئَنْتَ مَهْمَهْ , c. seq. مَهْمَهْ مَهْمَهْ colaphis caesus.

لِئَنْتَ مَهْمَهْ , v. s. لِئَنْتَ مَهْمَهْ .

لِئَنْتَ مَهْمَهْ , vox ar. رَسُولْ , apostolus ; legatus.

لِئَنْتَ مَهْمَهْ , fut. مَهْمَهْ stillavit, fluxit ; trans. stillare fecit,

cfr. *neo-ar.* رَشْهَةٌ *puerum*
aqua baptismatis aspersit
(*gall.* ondoyer).

فَحْمَدٌ ; stillatio, fluxio; stillicidium, gutta.

فَحْمَدٌ , ar. رَشْهَةٌ , fut. مَوْهَنٌ instilavit; aspersit, conspersit; intrans., stillavit, Part. act. præs. فَحْمَادٌ . Part. pass. فَحْمَدٌ ; subst. فَحْمَدٌ ; pl. فَحْمَادٌ et فَحْمَادٌ stillicidium.

Ethpe. فَحْمَدٌ sparsus, conspersus est.

Pa. فَحْمَدٌ sparsit, instillavit, roravit.

Ethpa. فَحْمَادٌ pass.

Aph. فَحْمَدٌ stillare, fluere fecit.

Palp. فَحْمَادٌ , ar. رَشْرَشٌ , aspersit.

فَحْمَادٌ aspersio; effusio; gutta.

فَحْمَدٌ ḥōūs, rhus arbor (*gall.* sumac, ar. شَعْقَاتٌ).

فَحْمَادٌ et فَحْمَادٌ ensis, cfr. gr. ρύμωχίς .

فَحْمَادٌ septum, ut فَحْمَادٌ q. v.

فَحْمَادٌ catena.

فَحْمَادٌ , v. s. فَحْمَادٌ .

فَحْلَةٌ , heb. רַשְׂהָה , ar. رَعْيٌ , pastum duxit, pavit gregem ; trop. curavit, rexit, gubern-

navit, c. فَحْلَةٌ ; intrans., pastus est. Part. act. فَحْلَةٌ , فَحْلَةٌ ; subst. v. infra. Part. pass. فَحْلَةٌ , nnq. فَحْلَةٌ , آفَحْلَةٌ ; it., ar. رَاضِيٌّ a رَاضِيٌّ , contentus, satisfactus, delectatus, c. فَحْلَةٌ ; gratum habens, f. emph. فَحْلَةٌ , subst. v. infra.

Pa. فَحْلَةٌ , heb. רַשְׂהָה , ar. أَرْضَى , contentum fecit, benevolum reddidit; placavit, reconciliavit. Part. act. مَهْلَكٌ , مَهْلَكٌ ; gratus.

Ethpa. فَحْلَةٌ pass. et refl. ; it. cogitavit, aestimavit; gloriatus est; studuit *rei*, egit. فَحْلَةٌ فَحْلَةٌ alte sapuit. Part. مَهْلَكٌ مَهْلَكٌ ; contentus. فَحْلَةٌ فَحْلَةٌ quid censem? فَحْلَةٌ pastio; pascuum. فَحْلَةٌ فَحْلَةٌ nomen plantæ (*gall.* panais sauvage).

فَحْلَةٌ , c. suff. فَحْلَةٌ vel فَحْلَةٌ , pl. فَحْلَةٌ et commun. فَحْلَةٌ pastor.

فَحْلَةٌ pabulum, pascuum; grex; it. rostrum elephantis.

فَحْلَةٌ pastio; pastoris officium. فَحْلَةٌ pastoralis.

فَحْلَةٌ , pl. فَحْلَةٌ mens, conscientia; sensus, cogitatio, opinio; sensus *rei*, interpretatio. فَحْلَةٌ concors

mente, voluntate ; assecla,
socius. حُمَّـا mentaliter.

مَـا reconciliator, propitia-
tor, placator.

مَـا , pl. مَـا , pascuum,
grex ; territorium, locus ju-
risdictionis ; diœcesis.

سَـا satisfactio, reconcilia-
tio ; concordia, pax.

أَـا , pl. أَـا , ut حُمَّـا
أَـا mentalis.

فَـا , emph. حُمَّـا , ar.
فَـا , رَغْوَة , spuma. حُمَّـا
وَـا selenitis lapis.

Aph. أَـا v. denom., spumavit.
فَـا f., pl. فَـا spuma.
مَـا et حُمَّـا spumosus.
مَـا spumositas.

فَـا , f. وَـا , ar. رَغْـا , mollis,
tener ; flexibilis, lenis.

مَـا mollities.
فَـا mollis.

مَـا f. pl. ova recenter ex-
clusa, cfr. حُمَّـا .

فَـا tremens.
Ethpa. أَـا , heb. רַזֵּד , ar.

إِرْتَدَـا , terrore percusus est.

فَـا adspectus.
فَـا tarditas ingenii.

فَـا , fut. حُمَّـا , timuit,

contremuit, trepidavit ; cfr.
רְזִיל Hoph. v. inus. רְזִיל , id.

Part. præs. فَـا , f. فَـا ,
pl. f. فَـا ; tremens, tremulus. Part. præt. فَـا .

Ethpe. حُمَّـا contremuit.

Aph. حُمَّـا tremefecit, terruit ;
it. tremuit.

فَـا ova recenter exclusa,
cfr. حُمَّـا .

فَـا , f. emph. فَـا , tremor ;
terræ motus.

فَـا , heb. רְזִיל , tremor.
فَـا commotus ; posterior in-
cedens ovis.

فَـا et فَـا , فَـا tremor, commotio.

فَـا , heb. רְזִיל , fut. strepuit, sonuit, murmuravit ; tonuit ; impers., حُمَّـا ingemuimus. Part. præt. فَـا ; sonans, strepens.

Ethpe. حُمَّـا ingemuit.

Ethpa. حُمَّـا ingemuit ; mur-
muravit ; tonuit, iratus est ;
proclamatus est.

Aph. حُمَّـا tonare fecit, tonuit.

فَـا ut فَـا .
فَـا tonitru ; sonitus, clangor
tubæ.

فَـا tremor, clamor ; mur-
mur, jurgium ; minæ.

وَهُدْمًا et وَهُدْمًا sonans, tin-
niens; lamentans, tristis;
iratus; lamentabilis. وَهُدْمًا لَدْنَا
lamentatur.
وَهُدْمَمًا cum ejulatu, lugubri-
modo.
وَهُدْمَمًا obstupefactio, stupor
mentis; indignatio.

وَهُدْمًا, al. وَهُدْمًا, v. s. وَهُدْمًا.

وَهُدْمَم, fut. نَسْنَمَه fricuit
pellem.
وَهُدْمًا et وَهُدْمًا frictio
pellis; intinctio; attenuatio.

وَهُدْمَم, fut. وَهُدْمَم fregit, contu-
dit, quassavit; cfr. وَلْ, heb.
רְצֵץ et רְצֵץ, ar. رَضَّ. Part.
act. وَهُدْمَم, وَهُدْمًا. Part. pass.
وَهُدْمًا, وَهُدْمًا; fragilis, debilis.
Ethpe. وَهُدْمَم pass.

Pa. وَهُدْمَم fregit, confregit, dif-
fregit.

Ethpa. وَهُدْمَم pass.

Palp. وَهُدْمَم confregit, contri-
vit, ar. رَضَرَض; it. abluit os.
وَهُدْمَم fractio, contusio, quassa-
tio; fissura.

وَهُدْمَم id.

وَهُدْمَم allisio, vexatio.

وَهُدْمَم fractus.

وَهُدْمَم et وَهُدْمَم quassatio,
confraction.

وَهُدْفَه et وَهُدْفَه oris ablutio.
وَهُدْفَه subcinericius panis, cfr.
كَسْفَه وَهُدْفَه; رَغِيف id.
وَهُدْفَه pl. وَهُدْفَه, it. وَهُدْفَه
urceus, hydria aquaria.
وَهُدْفَه, fut. نَسْنَمَه dilaniavit,
contrivit.
وَهُدْمَه et وَهُدْمَه etc., v. وَهُدْمَه s. .

وَهُدْفَه, heb. רַפָּה, ar. رَفَة, fut.
نَفَقَ laxus fuit; it. sanavit,
reparavit, heb. רַפָּא, ar. رَفَأَ
et رَفَقَ. Part. præt. pass. وَهُدْفَه,
لaxus, remissus; socors,
piger; ap. gramm., أَلَّا وَهُدْفَه litteræ molles vel aspiratæ.

Ethpe. وَهُدْفَه dissolutus est.
Pa. وَهُدْفَه laxavit, dissolvit.
Ethpa. وَهُدْفَه pass. et refl.;
trop. defecit; remissus fuit, ef-
feminatus fuit. وَهُدْفَه كَتَهُدْمَه
indulxit cupiditatibus.

Aph. وَهُدْفَه relaxavit, dimisit,
dereliquit; debilem, remissum
reddidit; trop. sivit, conces-
sit, permisit; it. supersedit.

وَهُدْفَه omittas quod; nedum.
وَهُدْفَه مُنْتَهَى وَهُدْفَه دَهْنَه mulierem repu-
diavit. Part. act. مَنْهُدْمَه.
مَنْهُدْمَه dimissio. Part. pass.
مَنْهُدْمَه مَنْهُدْمَه; laxus, mollis.
مَنْهُدْمَه mollities, segnities; lan-
guor, negligentia; vanitas.

لَّا فَقْمَدَ	laxe.	فَلَّا فَرَفَقَ	Palp. رَفَرَفَ, ar. motitavit.
لَّا فَقْمَدَا	mollitudo, actus mol- liendi.	أَفَلَّا فَوْكَ	Aph. لَّا فَوْكَ movit.
لَّا فَقْمَدَمَا	dis- solutio, negligentia.	فَقْمَدَا	motus, agitatio; mem- brorum palpitatio; nictus <i>oculi</i> , inde momentum tempo- ris; حَلْقَهُ حَلْقَهُ in ictu oculi, in uno momento. فَقْمَدَا بَحْرَهُ cordis exsultatio.
لَّا فَقْمَدَا	fut. فَقْمَدَ serpsit.	فَقْمَدَا	momentaneus.
لَّا فَقْمَدَا	statera major.	فَقْمَدَا	pl. فَقْمَدَا, agmen, turba, ar. فَقْمَدَا
لَّا فَقْمَدَا	, neo-ar. رَفَخَ, fut. فَقْمَدَا	فَقْمَدَا	agmen avium;gregatim; it. repositorium, ar. رَفَخَ (gall. rayon, étagère).
Ethpa. لَّا فَقْمَدَا	id.	فَقْمَدَا	فَقْمَدَا
لَّا فَقْمَدَا	tumor.	فَقْمَدَا	pruritus, pustulæ.
لَّا فَقْمَدَا	tumens, tumidus.	فَقْمَدَا	commotio, alarum mo- titatio.
لَّا فَقْمَدَا	لَّا فَقْمَدَا intumescentia.	فَقْمَدَا	رَفَشُ, ar. vannus, ventila- brum; humerus. حَلْقَهُ فَقْمَدَا
لَّا فَقْمَدَا	لَّا فَقْمَدَا sartor.	فَقْمَدَا	interscapulum.
لَّا فَقْمَدَا	scopae.	لَّا فَقْمَدَا	se movit,
لَّا فَقْمَدَا	, heb. כְּבָשׂ, ar. رَفَسُ , fut. فَقْمَدَا calce feriit, calcitravit, conculeavit, c. acc. vel ɔ; intr., exsultavit, saltavit.	لَّا فَقْمَدَا	palpitavit; serpsit <i>ulcus</i> ; per extens., altius subiit: secatuit <i>vermibus</i> ; redundavit, plenus fuit. Part. præs. فَقْمَدَا; subst.
لَّا فَقْمَدَا	calcitratio; saltatio, con- culeatio.	لَّا فَقْمَدَا	reptilia; chordæ. Part. præter. فَقْمَدَا; abundans.
لَّا فَقْمَدَا	id.; ludus.	لَّا فَقْمَدَا	et فَقْمَدَا commotio, pertur- batio, motus; causa motus, impulsus.
لَّا فَقْمَدَا	لَّا فَقْمَدَا cervus, dama; it. خَرْبَقَهُ, potio.	لَّا فَقْمَدَا	motus.
لَّا فَقْمَدَا	pars momenti temporis.	لَّا فَقْمَدَا	infixit; invol-
لَّا فَقْمَدَا	, ar. رَفَسُ , fut. فَقْمَدَا se commovit; nictavit <i>oculus</i> ; excussit alas avis.	لَّا فَقْمَدَا	
Pa. فَقْمَدَا	fovit.		
Ethpa. لَّا فَقْمَدَا	commotus est.		

vit; resarcivit. <i>Part. pass.</i>	فَرِيزاً contusio, contritio.
فَرِيزاً; pannis involutus.	فَمْدَأا, ar. فَرِيزَة, uter, vas.
Pa. فَرِيزاً infixit. <i>Part. pass.</i>	فَمْحَنَا, pl. فَمْحَنَتْا mutulus.
فَرِيزاً, مَهْرِيزاً.	
فَرِيزاً confirmatio, conjunctio, restauratio, reparatio.	
فَرِيزاً, fut. فَرِيزَه manare fecit, stillavit; <i>intrans.</i> , emanavit, fluxit; scaturivit <i>fons</i> .	فَصَبَّ, heb. רִקֵד, ar. رَقَص, fut. فَصَبَّتْ saltavit, subsiliit.
فَرِيزاً et نَفْرِيزاً stillatio, emanatio, stillicidium, gutta.	Ethpe. فَرِيزَاتْ saltationibus memoria defuncti defleta est.
فَرِيزاً morbus pruriginosus.	Pa. فَصَبَّ saltavit, gaudio exsultavit; saltare fecit.
فَرِيزاً fons, rivus; cisterna.	Aph. فَرِيزَه deploavit, planxit.
فَرِيزاً dim., fonticulus.	Ettaph. فَرِيزَاتْ pass.
فَرِيزاً, heb. رَضَق, ar. رَضَف, fut. فَرِيزَه compegit; stravit <i>lapidibus viam</i> , munivit.	فَمْهَى et فَمْهَى saltatio.
Part. pass. فَرِيزَه; compactus, densus; subst. f. emph. فَرِيزَه et. c. ل prosth. فَرِيزَه vel دَافِقا فَرِيزَه pavimentum, ar. رَصِيف.	فَمْهَوا et فَمْهَوا saliens, saltator.
Ethpe. فَرِيزَاتْ pass.; condensatus est, spissatus est.	فَمْهَمَهْدا, pl. فَمْهَمَهْدا planctus, luctus, gemitus; manuum contorsio.
فَرِيزاً pavementum.	فَمَهْدَهْدا lugubris.
فَرِيزاً stratura.	فَمَهْدَهْدا, f. فَمَهْدَهْدا plangens.
فَرِيزاً, heb. رَضَن, ar. رَضَف, fut. فَرِيزَه contudit, confregit.	فَهَمَهَه - cfr., heb. רָקַע, ar. رَقَع, acu pinxit, variegavit.
Ethpe. فَرِيزَاتْ pass.	فَهَمَهَه puncta, maculae variegatae in cute (<i>gall. tatouage</i>).
Pa. فَرِيزاً confregit.	فَهَمَهَه رُخَّاخَنَη, runcina (<i>gall. rabot</i>).
	فَهَمَهَه, heb. رَكَن, ar. رَقَم, fut. فَهَمَهَه arctavit, compressit, compegit, firmavit, coarctavit, subegit; extendit, expandit. Part. pass. فَمَهْمَهْدا; it. adject., nnq. فَمَهْمَهْدا, spissus,

compactus ; subst. فَمْهًا et c. l prosth. أَوْهَمْدًا , heb. רְקִיֵּן , ar. رَقِيمٌ , firmamentum.	maris, fluvius; vadum, ar. رَقٌ .
<i>Ethpe.</i> فَسْلًا pass.	وَهَمْهَا , al. وَهَمًا vilis, contemptus, stultus; subst. testudo, ar. رَقٌ .
<i>Aph.</i> وَهَمٌ ut Pe.	وَهَمَّا mentha.
<i>Ettaph.</i> فَسْلًا pass.	وَهَمْهَا subtilis, tenuis, ar. رَقِيقٌ ; it. vilis.
فَمْهًا , pl. وَهَمْهَا , emph. وَهَمْهَا , ar. رُقْة, it. وَهَمْهَا , pl. وَهَمْهَا , pannus; it. in st. abs., charta qua scribitur, فَمْهًا compactio, formatio, fundatio.	وَهَمْهَا tenuitas.
فَمْهًا firmus.	مَنْهَمَا , ar. مَرَاقٌ, epigastrium, pars mollior ventris.
فَمْهَا tigillum, trabs lignea.	فَمْهًا et وَهَمًا omne animal repens, reptile; cfr. وَهَمًا .
فَمْهَا tectus.	
فَص , heb. רַקָּה et רַקֵּה fut.	فَعًا , fut. تَنْهَمًا culpavit, in- cusat; conquestus est, c. كَلْ vel كَلْهُ rei.
فَص spuit, exspuit, con- spuit; أَنْكَهُ أَحَمَّهُ مَنْهَمَ وَهَمَ وَهَمَّهَا si pater ejus spuisset in faciem illius; trop. rejicit, respuit, fastidivit; it. c. fut. فَصًا , ar. رَقٌ , tenuis, subtilis fuit. Part. فَمْهًا , وَهَمْهَا ; vilis.	فَعًا culpatus est, objurgatus est.
<i>Ethpe.</i> فَهَلًا consputus est; it. dissipatus est, defecit.	فَعَكَ obtulit donum; cfr. ar. رَجَ dono aliquem sibi conciliavit.
<i>Pa.</i> فَعَنْ exspuit sanguinem.	<i>Aph.</i> أَوْهَمٌ culpavit, c. كَلْ rei; أَوْهَمَ لَهَمَّهَا beneficium contulit.
<i>Aph.</i> فَهَمٌ tenuem, nitidum effecit; suppuravit.	فَهَمًا reprehensio, culpatio; crimen, culpa, opprobrium; it. ut seq.
<i>Palp.</i> فَهَمَ denom. a فَهَمًا , vane prætendit.	فَهَمًا donum, munus, beneficium.
فَهَمٌ sputum.	فَهَمَّا reprehensor, accusator.
فَهَمًا actus spuendi; it. sinus	فَهَمًا liberalis.
	فَهَمَّهَا reprehensio, vi- tuperatio, culpa.
	مَنْهَمَّا beneficium.
	وَهَمْهَنَّا clitellæ.

فَعَلٌ, fut. **فَعَلَ** laxus fuit, remissus fuit, languit; torpuit manus; pendula fuit auris, cfr. ar. رِسْلٌ propendula fuit coma.

Ethpe. **فَعَلَ** dissolutus est, languit.

Pa. **فَعَلَ** dissolvit, remisit.

Ethpa. **فَعَلَ** pass.; inductus est.

Schaph. **فَعَلَ** pendere sivit.

Part. pass. **فَعَلٌ**; longus, prolixus.

Aph. **فَعَلَ** relaxavit; ire sivit, dimisit, dereliquit, ar. أَرْسَلَ misit; trop. pepercit, condonavit; concessit, permisit; inde habenas passionibus laxavit; *intrans.*, tremuit.

فَعَلٌ remissio, dissolutio, mol-lities; longitudo aurium vel caudae ovis etc.; *it. al.* **فَعَلٌ**, flaccidus, carnem flaccidam habens.

فَعَلٌ dissolutio artuum; tremor.

فَعَلٌ manuum jactatio. **فَعَلٌ** torpor; convulsio, spasma.

فَعَلٌ mortarium, *ut* **فَعَلٌ**.

فَعَلٌ, ar. **رَسَمٌ**, fut. **فَعَلَ** signavit; delineavit, figura-

vit; scripsit. **فَعَلٌ** وَكَحْلٌ se eruce signavit. **فَعَلٌ** prius sibi proposuit, præstituit.

Ethpe. **فَعَلٌ** pass.

Aph. **فَعَلٌ** delineavit, descripsit.

فَعَلٌ crucis signi formatio.

فَعَلٌ وَهُدْعَةٌ signum, nota, character; consignatio, notatio; exemplar libri; *it. ut* **فَعَلٌ** وَهُدْعَةٌ et **فَعَلٌ** pars statuta, portio boni, fortunæ.

فَعَلٌ مَدْعَةٌ instrumentum pictoris. **فَعَلٌ** et deriv., v. s. **فَعَلٌ**.

فَعَلٌ, heb. **בָּשַׁר**, fut. **فَعَلَ** deliquit, improbus fuit.

Aph. **فَعَلٌ** impie, scelestè egit; deliquit, c. **כ**; apostata fuit; **לֹא** **וְ** **מִתְחַדֵּה** **מִן** **אֶקְהָלָה** **וְ** **מִתְ** non impie gessi a Deo meo, h. e. non deliqui adversus eum; *it. trans.*, ad peccatum impulit.

فَعَلٌ perpetratio mali; scelus. **فَعَلٌ** impetas, infidelitas; scelus, peccatum.

فَعَلٌ; impius, improbus, peccator; infidelis, sceleratus.

فَعَلٌ impie, inique, scelerate. **فَعَلٌ** impietas, iniquitas; scelus, peccatum.

فَعَلٌ, fut. **فَعَلَ** et **فَعَلٌ**

reptavit, serpsit. حَمْرَةٌ حَمْرَةٌ حَمْرَةٌ حَمْرَةٌ

inceperunt in orbem se extendere.

Part. præs. حَمْرَةٌ ; *emph. et subst.* حَمْرَةٌ reptile.

Ethpe. حَمْرَةٌ serpsit.

Aph. حَمْرَةٌ repere, serpere fecit.

حَمْرَةٌ reptatio.

حَمْرَةٌ id.

حَمْرَةٌ reptans; reptile, serpens.

حَمْرَةٌ , ar. رَشْقٌ , fut. حَمْرَةٌ jaculatus est.

Ethpe. حَمْرَةٌ projectus est, jaculis petitus est, projectus est.

حَمْرَةٌ jaculatio, projectio; *it.* semen rosæ.

حَمْرَةٌ , fut. حَمْرَةٌ contudit, comminuit, confregit, decorticavit; *cfr.* Po. v. *inus*.

Ethpe. حَمْرَةٌ contusus est, comminutus est.

Pa. حَمْرَةٌ minutatim confregit, contudit; penitus decorticavit.

Ethpa. حَمْرَةٌ pass.

Aph. حَمْرَةٌ contudit.

حَمْرَةٌ comminutio, contusio, confractio.

حَمْرَةٌ pistillum; mortarium.

حَمْرَةٌ , pl. حَمْرَةٌ mortarium; pilum; labrum.

حَمْرَةٌ , v. حَمْرَةٌ .

حَمْرَةٌ , fut. حَمْرَةٌ ut communius Aph., *cfr.* حَمْرَةٌ .

Aph. حَمْرَةٌ monuit, admonuit, hortatus est; docuit, erudit; correxit.

Ettaph. حَمْرَةٌ pass.

حَمْرَةٌ et حَمْرَةٌ hortatio.

حَمْرَةٌ edoctus ab alio, catechizatus, catechumenus.

حَمْرَةٌ admonitor, hortator; concionator.

حَمْرَةٌ admonitio, institutio, prædicatio, cathechesis.

حَمْرَةٌ , heb. Pi. v. חִמָּרָה , fut.

حَمْرَةٌ ferbuit, ebullivit; exarsit, æstuavit *ignis*; *trop.* æstuavit desiderio, amore vel studio flagravit, cupivit.

حَمْرَةٌ viscera ejus commota sunt. حَمْرَةٌ mente incendebatur.

حَمْرَةٌ حَمْرَةٌ حَمْرَةٌ estote spiritu ferventes.

Aph. حَمْرَةٌ calefecit, ardere fecit, bullire fecit; *trop.* desiderium excitavit, desiderio affecit.

Schap. حَمْرَةٌ exundare fecit, copiose effudit; opulentum reddidit, ditavit; *it.* copiosus

fuit, abundans. *Part.* مُهْمَّةٌ
dives, fertilis; generosus.

Eschtaph. اَسْتَهْمَّهُ
abundavit,
viguit, floruit; superabunda-
vit; major fuit.

اَسْتَهْمَّهُ et اَسْتَهْمَّهُ, *emph.* اَسْتَهْمَّهُ
ebullitio, ardor; aestus, libi-
do; cupidus, zelus; *in pl.*
اَسْتَهْمَّهُ scabies sicca, impetigo,
pustulæ e nimio sudore pro-
venientes.

اَسْتَهْمَّهُ incensus.

اَسْتَهْمَّهُ calor, aestuatio.

اَسْتَهْمَّهُ abundantia, excessus;
augmentum; divitiae.

اَسْتَهْمَّهُ augmentativus.

اَسْتَهْمَّهُ copiose, abundan-
ter.

اَسْتَهْمَّهُ copia, abundantia,
divitiae.

اَسْتَهْمَّهُ, *fut.* اَسْتَهْمَّهُ susurravit,
submissa voce pronuntiavit,
balbutivit, locutus est; stre-
pere fecit, sonum edidit; *cfr.*
ar. اَرْتَهُ balbus *et* اَرْتَهُ balbu-
tit. *Part. pass.* اَسْتَهْمَّهُ; bal-
butiens, edentulus.

Aph. اَسْتَهْمَّهُ garrivit, vana lo-
catus est, deliratus est.

اَسْتَهْمَّهُ susurratio, balbuties;

effatum, vox; nomen accentu-
tus; *it.* nictus oculi.

اَسْتَهْمَّهُ, *fut.* اَسْتَهْمَّهُ exagitavit,
commovit, terruit. *Part.*
pass. اَسْتَهْمَّهُ demissus.

Aph. اَسْتَهْمَّهُ dimovit, *c.* اَسْتَهْمَّهُ; evul-
sit, eradicavit; dissolvit, con-
tudit; discidit; terruit, per-
turbavit.

اَسْتَهْمَّهُ commotio, conturbatio,
motus, agitatio; tremor, hor-
ror.

اَسْتَهْمَّهُ commotio, motus; laxa-
tio, remissio.

اَسْتَهْمَّهُ agitans.

اَسْتَهْمَّهُ ut اَسْتَهْمَّهُ.

اَسْتَهْمَّهُ — *Aph.* اَسْتَهْمَّهُ pupugit.

اَسْتَهْمَّهُ, *fut.* اَسْتَهْمَّهُ tremuit, contre-
muit. *Part. præs.* اَسْتَهْمَّهُ, اَسْتَهْمَّهُ
Part. præt. اَسْتَهْمَّهُ et اَسْتَهْمَّهُ,
trepidus; *subst. v. infra.*

Pa. اَسْتَهْمَّهُ contremuit.

Aph. اَسْتَهْمَّهُ terruit, perterruit.

اَسْتَهْمَّهُ dolor in pulmone, *v. s.*
اَسْتَهْمَّهُ.

اَسْتَهْمَّهُ et اَسْتَهْمَّهُ *c.*, sine *pl.*, ti-
mor, terræmotus; *it.*, *ut* اَسْتَهْمَّهُ,
admonitio.

اَسْتَهْمَّهُ tremor.

— seu **مُعْتَدِلٌ** vigesima prima littera Syrorum; *valet numero*: **مٰ = 300; بٰ = 3,000,000;** **بٰ** = tercentesimus.

1º *Est littera sibilans; æquivalet heb. ش , حكّه , معاً , مبّه , heb. شـلـهـ , قـنـسـ , كـرـدـ , et redditur pler. per ar. س , cfr. c. præc. فـذـسـ , قـسـاـ , سـلـهـ , شـلـهـ مـطـ , littus, et rarius per heb. شـ : شـ مـنـهـ , concidit; nnq. respondet ar. تـ : تـ مـنـهـ relictus est, ar. تـكـ reliquit.*

2º *In servit ad formam quadrilit. quam dicunt Schaphel componendam, v. g. مـجـ in servitutem redigit, a حـ servivit, مـهـوـهـ notificavit, a شـبـ novit.*

3º *Pronuntiatur ut ch Gallorum, sh Anglorum, sch Germanorum; ap. Nestor. pronuntiatur ut ar. شـ , ante دـ , شـ et ئـ dura, v. g. شـهـ مـحـتـاـ = houdjbana, شـبـهـ*

= nedjdoun, شـهـ = nedjgeroun.

حـلـبـاـ, cfr. حـشـ et assyr. sidu, pl. مـأـبـةـتـاـ, مـأـبـةـتـاـ diabolus, dæmon, dæmonium.

حـلـفـنـاـ et حـلـفـنـاـ diabolicus, dia-
bolo similis.

حـلـوـنـاـ conditio diaboli, opera
diabolica.

حـلـفـنـاـ et حـلـفـنـاـ, pers.
شـاهـتـهـ, fumaria planta (gall. fumeterre).

حـلـ, heb. حـلـ, ar. حـلـ, fut. حـلـمـ, pl. حـلـكـمـ postu-
lavit, petiit; quæsivit, inter-
rogavit. مـلـحـدـهـ vel حـلـحـدـهـ
حـلـحـدـهـ salutavit eum. حـلـحـدـهـ
حـلـحـدـهـ مـلـحـدـهـ postulavit ab eo
verbum pacis, h. e. fidem
ejus imploravit. Part. act.
حـلـلـ . Part. pass.
حـلـمـ, nnq. حـلـلـ ; adj. pre-
rius, mutuatus; allegoricus.
Ethpe. حـلـمـ, f. ap. Occident.
أـمـهـاـكـهـ, pass.; se rogan-
dum curavit; recusavit, no-

لuit; it. abdicavit. مَنْمَهُ حَمْدَهُ اَكْهَهُ incepunt *invitati* se excusare.

Pa. مَأْكَهُ , f. مَأْكَهُ suff. مَأْكَهُ , مَأْكَهُ et مَأْكَهُ , fut. مَأْكَهُ , c. suff. مَأْكَهُ , مَأْكَهُ interrogavit, per- cunetatus est, inquisivit de re, c. مَأْكَهُ vel مَأْكَهُ .

Ethpa. مَأْكَهُ pass.

Aph. مَأْكَهُ commodavit, mutua- tus est; it. ut مَأْكَهُ .

مَأْكَهُ , et c. poet. licentia مَأْكَهُ , pl. مَأْكَهُ ; c. suff. مَأْكَهُ , مَأْكَهُ petitio, interrogatio; preces; requi- sita res. مَأْكَهُ مَأْكَهُ et مَأْكَهُ مَأْكَهُ salutatio. مَأْكَهُ كَهُ supellex domus.

مَأْكَهُ , مَأْكَهُ interrogans, pe- tens.

مَأْكَهُ quæstio, petitio.

مَأْكَهُ petitio, mutuum; مَأْكَهُ مَأْكَهُ exuat a se faciem adjectitiam; in pl. مَأْكَهُ quæsita.

مَأْكَهُ , et c. l prosth. مَأْكَهُ , mutuo, adscititie; metapho- rice.

مَأْكَهُ petitio, interrogatio, مَأْكَهُ interrogativus.

مَأْكَهُ id.; ap. gramm., no- men accentus interrogativi;

أَوْهُ مَهْكَهُ nomen interroga- tivum.

مَهْكَهُ commodatio, mu- tuum.

مَهْكَهُ اَكْتَهُ اَكْتَهُ interpellatio; ex- cusatio; abdicatio.

مَهْكَهُ اَكْتَهُ اَكْتَهُ cunctanter; c. مَهْكَهُ , sine mora.

مَهْكَهُ , v. s. مَهْكَهُ .

مَهْكَهُ , v. s. مَهْكَهُ .

مَهْكَهُ اَكْتَهُ اَكْتَهُ et مَهْكَهُ catena, annularum catena; armilla, brachiale; cfr. ar. سِوار . مَهْكَهُ اَكْتَهُ اَكْتَهُ et مَهْكَهُ مَهْكَهُ , pl. مَهْكَهُ serica vestis.

مَهْكَهُ , heb. שְׁבֵחַ , ar. سَبَقَ , fut. مَهْكَهُ captivum fecit, cepit, ab- duxit; trop. abripuit, illexit, seduxit. مَهْكَهُ حَمْهَهُ وَهَنْهَهُ vinum quod vi sua aufert mentem. Part. act. مَهْكَهُ , c. suff. مَهْكَهُ . Part. pass. مَهْكَهُ , مَهْكَهُ ; مَهْكَهُ mente captus, f. emph. et subst. مَهْكَهُ v. infra.

Ethpe. مَهْكَهُ pass.; trop. مَهْكَهُ اَكْتَهُ اَكْتَهُ اَكْتَهُ مَهْكَهُ Edessa aquarum præda facta est.

Aph. مَهْكَهُ captivum duxit, abduxit; captivitati tradidit.

مَهْكَهُ captivitas, transmigratio. مَهْكَهُ , c. suff., مَهْكَهُ ,

مَحْتَمَةً , pl. مَحْتَمَاتٍ captivi-
tas ; ipsi captivi.

مَحْتَمٌ captivator, deprædator.
مَهْتَمَةً captivitas.

مَهْتَمٌ , fut. نَفَعٌ , demissus
est, descendit; declinavit;
transit. c. fut. نَفَعٌ demisit,
submisit. Part. præt. pass.
مَهْتَمٌ ; subst. v. infra.

Pa. مَهْتَمٌ descendere fecit, de-
misit.

Aph. أَمْتَحَ id. ; v. etiam نَفَعٌ .
مَهْتَمٌ vicinus, propinquus; مَهْتَمٌ يَوْمًا , مَهْتَمٌ
potamogeton, planta aqua-
tica. مَهْتَمٌ رَّفِيْنَا aurora, ut
مَهْتَمٌ رَّفِيْنَا .

مَهْتَمَةً vicinitas; pl. مَهْتَمَةً
viciniæ, loca circumstantia;
vicus urbis (*gall. quartier*);
أَمْتَحَ مَهْتَمَةً præfecti vico-
rum.

مَهْتَمَةً deorsum vergens.
مَهْتَمَةً et مَهْتَمَةً , مَهْتَمَةً nigel-
la sativa *planta*.

مَهْتَمٌ venæ.
مَهْتَمٌ , emph. مَهْتَمٌ laqueus;
it. radius, scintilla, splendor;
cfr. ar. شَبَابٌ et heb. شَبَابٌ flamma; مَهْتَمٌ سَوْفَ ; radii,
scintillæ volantes. مَهْتَمٌ

diluculum.

مَهْتَمَةً dysuria.

مَهْتَمٌ et deriv., v. s. مَهْتَمٌ .
مَهْتَمٌ , v. s. حَدَّةٌ .

مَهْتَمٌ , usitat. in Part.
pass. مَهْتَمَسٌ , laudatus ; adj.
laudabilis ; eximus ; subst.
gloria ; pl. مَهْتَمَاتٍ magnalia.
مَهْتَمٌ مَهْتَمَسٌ دَافِقٌ honoratus, spec-
tatissimus vir.

Pa. مَهْتَمٌ laudavit, heb. שָׁבֵשׁ ,
ar. مَهْتَمٌ لَّا كُنْهُداً da glo-
riam Deo ; مَهْتَمَةً مَهْتَمَسٌ
لَّا كُنْهُداً glorificavi et adhuc
glorificabo ; it. opinatus est.
Part. pass. مَهْتَمَسٌ f. emph.
مَهْتَمَسٌ laudabilis; pl. f.
مَهْتَمَسٌ laudabilia ; mirabilia.
Ethpa. مَهْتَمَسٌ pass. et refl ;
gloriatus est.

مَهْتَمَسٌ laus, gloria ; opinio ; pars
cantici. حَنَّا مَهْتَمَسٌ tonus al-
teri respondens ; مَهْتَمَسٌ مَهْتَمَسٌ
cantatrices. لَوْمَى مَهْتَمَسٌ orthodoxus.
حَنَّا مَهْتَمَسٌ infamia.

مَهْتَمَسٌ مَهْتَمَسٌ vana gloria.

مَهْتَمَسٌ dim., gloriola.
مَهْتَمَسٌ gloria, splendor.

مَهْتَمَسٌ gloriose, laudabiliter.
مَهْتَمَسٌ , c. præc. فَقَتَّ , struthio-
camelus, al. fabulosa avis, v.
دَنْفٌ .

مَهْتَمَسٌ laudans, laudator. f.

pl. مُحَسِّنَاتٌ	cantatrices.
مُحَمَّدٌ حَسْنٌ	laudabilis.
مُحَمَّدٌ حَسْنَةٌ	laudabilitas.
مُحَمَّدٌ سَدْلَةٌ	, st. c. مُحَمَّدٌ سَدْلَةٌ c. suff. مُحَمَّدٌ سَدْلَةٌ, مُحَمَّدٌ سَدْلَةٌ ,
pl. مُحَمَّدٌ عَظِيمٌ	laus, gloria, honor ; hymnus, cantil- eum. مُحَمَّدٌ سَدْلَةٌ hymnus modulatus. مُحَمَّدٌ سَدْلَةٌ كَفَ gratias egit alicui.
مُحَمَّدٌ سَدْلَةٌ	laudabilis, glorio- sus.
مُحَمَّدٌ سَدْلَةٌ	, pl. مُحَمَّدٌ سَدْلَةٌ dim., cantio, cantiuncula, cantile- na.
مُحَمَّدٌ سَدْلَةٌ	gloriosus.

لَعْنَدُ, fut. لَعْنَدَهُ se ex-
tendit; volavit; cfr. ar. لَعْنَدٌ
id., et لَعْنَدٌ propendula fuit
coma. Part. act. لَعْنَدٌ مَحْمَدٌ;
subst. caro spec. porcina con-
cisa et salita.

Pa. **فَحَّ** extendit, ductile redidit *ferrum*; cælavit. *Part.* pass. **فَحُقَّ**, f. **فَحَّةٌ**; percussus.

Ethpa. ଫାନ୍ଦୀ pass.

مُخْرَج coma pendula.

مَحْفَلٌ *heb.* מַחֲלָה, *virga*, *scípío*,
flagellum; *sceptrum*; *tribus*,
gens israelitica, *ar.* مَحْفَلٌ.
مَحْدَعٌ flagellum; *clavulus*.

لَامِه مَدْحُوا lamina metalli.

مَدْحُوا sparulus *piscis*, ar. شَبُوط (gall. turbot).

مَدْحُوا, heb. שְׁבָט, ar. شَبَاط, mensis fere Februario respondens.

مَدْحُوا polygonum *planta*.

مَدْحُوا planus *locus*, plana terra.

شَبَابِلْ مَدْحُوا, heb. شَبَابِلْ et شَبَابِلْ, ar. شَبَابِلْ via, semita, vestigium. **مَدْحُوا** أَدْتَنْ via lactea.

Pa. مَدْحُوا v. *denom.*, viam apertuit, viam rectam monstravit; duxit, direxit.

Ethpa. مَدْحُوا? pass.

مَدْحُوكَه dim., via parva, semita.

شَبَابِلْ مَدْحُوا, pler. f., heb. شَبَابِلْ , ar. سُنَنْ , f. *emph.* مَدْحُوكَه et مَدْحُوكَه spica, pl. مَدْحُوكَه ; it. مَدْحُوكَه signum Zodiaci, Virgo مَدْحُوكَه وَهَذَا nardus agrestis. مَدْحُوكَه نَرْدَا spica nardi.

مَدْحُوكَه, heb. شَبَابِلْ , alveus fluminis.

مَدْحُوكَه rectam viam monstrans, dux, director.

مَدْحُوكَه dirigens, dux.

مَدْحُوكَه, مَدْحُوكَه direc-tio.

مَحْ, *st. abs. c. fem. usurp.*
heb. שְׁבִי, *ar. سَبِيْ*, *st. emph. c. masc. usurp.* مَحْدَى, *heb. شَبَّيْهَا*, *ar. سَبَّيْهَا*, *septem*; *c. suff.* مَحْدَى etc.; مَحْدَى *etc.* مَحْدَى septem boves; مَحْدَى كُسْكُسٌ septem panes; *distribut.* مَحْدَى مَحْدَى *f., it.* مَحْدَى مَحْدَى *septenae*; *septies.* تَسْبِيْرٌ مَحْدَى دَسْبَ لَحْنَةً assument septem mulieres virum unum. مَحْدَى septimus; مَحْدَى septima; *subst.* مَحْدَى septima dies, *c. c. usurp.* مَحْدَى septima die. مَحْدَى مَهْمَهْ hebdomas. مَحْدَى *m., it.* مَحْدَى et communius; مَحْدَى septendecim, *f.* مَحْدَى et مَحْدَى septuaginta. دَمْحَدَى مَحْدَى usque septuagies septies.

مَحْتَنَةً numerus septuagenerius.

مَحْمَدًا septingenti.

مَحْمَدًا, *f. emph. مَحْمَدًا*, *pl. مَحْمَدَاتٍ*, *ar. مَحْمَدَة* et مَحْمَدَة, *septimana*, *hebdomas*; مَحْمَدَة id; مَحْمَدَة خَاتِمًا وَمَحْمَدَة خَاتِمًا festum Pentecostes.

مَحْمَدًا septimus, *f. emph. مَحْمَدًا* septima; *in pl. subst.* مَحْتَنَةً planetæ septem.

مَحْتَنَةً septuagesimus, septuagenarius; وَسْتَانْ مَحْتَنَةً et مَفْعَمًا مَحْتَنَةً, *vel etiam absol.* septuagintaviralis versio.

Pa. مَحْ *v. denom.*, in septem partes divisit; ad septem usque numerum auxit.

مَحْرَق, *heb. حَرْقَنْ*, *fut.* confudit, miseuit, commisuit. مَحْرَا confusio, permixtio.

مَحْرَق, *chald. حَرْقَنْ*, *fut.* مَحْرَق emisit, injecit, dimisit; ignem admovit; dereliquit, repudiavit; prætermisit, omisit; trop. remisit debitum, culpam condonavit, c. vel مَحْرَق; permisit, sivit; imp. مَحْرَق; *adv.* adhuc, a fortiori. مَحْرَق مَحْرَق prætermisso quod, præterea quod. مَحْرَق وَنَعْدَدَ مَحْرَق مَلْ مَلْ antequam verbum emittat. مَحْرَق مَحْرَق أَمْبَرْ مَحْرَق me dereliquit. مَحْرَق وَنَعْدَدَ لَأْكَلْ neglexit supplicationes ad Deum. حَمْنَانْ لَا مَحْرَق نَوْبَسْ, non sivit eum nobiscum venire. لَهَدَانْ مَحْمَدَه ire neglexistis. لَهَدَانْ دَنْعَمَه وَنَادَبْ سَلْمَه مَحْمَدَه ne sinas animam tuam perire morte peccati.

<i>Part. act.</i> مَحْمَدٌ ; <i>subst.</i> مَحْمَدٌ	pueriliter.
أَنْدَلُبٌ وَمَحْمَدٌ rivuli aquarum. <i>Part. pass.</i> مَحْمَدٌ ; <i>f.</i> مَحْمَدًا repudiata mulier.	مَحْمَدًا et مَحْمَدًا peganum planta (gall. rue).
<i>Ethpe.</i> أَمْحَصٌ pass. مَحْمَدٌ , مَحْمَدٌ emissio.	مَحْمَدًا ellychnium.
مَحْمَدٌ dimissio.	مَحْمَدٌ pers., chalybs.
مَحْمَدٌ dimissio, repudium ; remissio, condonatio, venia.	مَحْمَدٌ inus. — <i>Pa.</i> مَحْمَدٌ , <i>ar.</i> شَيْثَ مَحْمَدٌ adhæsit familiariter, adulatus est.
مَحْمَدٌ condonans, condonator.	<i>Ethpa.</i> مَحْمَدٌ adulatione circumventus est.
مَحْمَدٌ مَحْمَدٌ condonatio, remissio, venia.	مَحْمَدٌ familiaritas, amicitia, blanditiæ.
مَحْمَدٌ pl. مَحْمَدٌ مَحْمَدٌ , emph. مَحْمَدٌ , pl. مَحْمَدٌ virga, surculus ; truncus, ramus, propago ; sceptrum.	مَحْمَدٌ et مَحْمَدًا مَحْمَدًا , f. pl. مَحْمَدٌ vitis, palmes, sarmentum.
مَحْمَدٌ dimissus.	مَحْمَدٌ dim., palmes.
مَحْمَدٌ dimissio, derelictio ; condonatio, permissio, licentia.	مَحْمَدٌ , <i>heb.</i> מַחְמָדָה , <i>ar.</i> سَبَتَ مَحْمَدٌ quievit, cessavit.
مَحْمَدٌ parvulus, puerulus, f. مَحْمَدٌ , pl. مَحْمَدٌ puella ; trop. simplex, pueriliter agens.	<i>f.</i> , <i>heb.</i> מַחְמָדָה , c. contract. in st. abs. مَحْمَدٌ , pl. مَحْمَدٌ , مَحْمَدٌ sabbatum ; hebdomas, <i>ar.</i> سَبَتَ مَحْمَدٌ prima dies hebdomadæ, dies dominica.
<i>Pa.</i> مَحْمَدٌ v. <i>denom.</i> , more puerorum egit. مَحْمَدٌ se demisit ad pueri mores.	مَحْمَدٌ اَوْسٌ مَحْمَدٌ feria secunda, dies lunæ. مَحْمَدٌ اَكْدَمٌ مَحْمَدٌ feria tertia, et ita porro usque ad مَحْمَدٌ feria sexta, dies veneris, <i>ar.</i> مَحْمَدٌ مَهْدٌ vel abs. مَحْمَدٌ . عَرْوَةَ مَحْمَدٌ dies sabbati. مَحْمَدٌ وَمَهْدَمٌ مَحْمَدٌ hebdomada Resurrectionis.
<i>Ethpa.</i> مَحْمَدٌ id.	مَحْمَدٌ f., pl. مَحْمَدٌ synagoga ; refectorium.
مَحْمَدٌ dim., infantulus.	
مَحْمَدٌ dim. f., puellula.	
مَحْمَدٌ pueritia.	
مَحْمَدٌ , pl. f. مَحْمَدٌ imperitus, rudis, insanus.	
مَحْمَدٌ et مَحْمَدٌ puerilis.	

Pa. حَدَّ *v. denom.*, sabbatum
celebravit.

Aph. حَدَّ *id.*

حَدَّمٌ sabbaticus ; hebdomada-
rius ; refectorius.

حَدَّتْنَا sabbaticus.

حَدَّا f., anethum, *ar.* شُبَّتْ.

حَدَّةٌ celebratio sabbati ;
quies.

حَدَّهُ , *vide* حَدَّ .

حَدَّ , fut. حَدَّا declinavit,
aberravit ; *cfr. heb.* حَنَّ , *id.*

Aph. حَدَّ errare fecit, aver-
tit ; distraxit, seduxit ; *it.*
intr. seq. حَدَّ , declinavit, a
se avertit ; erravit, neglexit.

حَدَّ et حَدَّ aberratio, error.

حَدَّ error.

حَدَّ , fut. حَدَّا obduxit, lini-
vit.

حَدَّا lippus.

حَدَّتْنَا lippitudo.

حَدَّا f., pl. حَدَّا amygdalus
arbor et fructus. حَدَّا مَتَّا
dissolutio intestinorum.

حَدَّ , fut. حَدَّا mutavit,
commutavit.

Pa. حَدَّ insinuavit, *ar.* حَدَّ .

حَدَّ vox pers., canis aureus
(gall. chacal).

حَمَلٌ , *ar.* شَفَلٌ , occupatio.

حَمَلَتْنَا difficulties.

حَمَلَكْنَا tibicen.

حَمَلَ , fut. حَمَلَ decepit,
fraudavit, seduxit ; distinuit,
occupavit ; *intrans.*, se occu-
pavit, studuit *rei. Part. pass.*
حَمَلَ ; *re aliqua* distentus, c.
ى .

Ethpe. حَمَلَ occupatus est,
se occupavit.

Aph. حَمَلَ occupavit, occupa-
tione distinuit.

حَمَلَ res vana, casus fortui-
tus ; confusio ; *adverb.* *c.* حَمَلَ ,
inconsulto ; حَمَلَ حَمَلَ mature, cum
consideratione. حَمَلَ حَمَلَ immodici imbræ. حَمَلَ حَمَلَ
opus inane.

حَمَلَ حَمَلَ confusio.

حَمَلَ حَمَلَ distrahens ; vanus,
futilis.

حَمَلَ securis ad cædendos lapi-
des.

حَمَلَ , pl. حَمَلَ morbi ende-
mici seu locales.

حَمَلَ حَمَلَ mutavit, immutavit ;
convertit, transtulit *a lingua*
in aliam ; *cfr.* حَمَلَ et *Pa.*

مُتَّ . Part. Pass. **مُتَّ** ,
مُتَّ , pl. **مُتَّ** ; varius.
Ethpali **مُتَّ** mutatus est,
conversus est; cfr. **مُتَّ** id.
مُتَّ, ut **مُتَّ** mutatio, con-
versio.

مُتَّ, ar. سَجَفَ, fut. **مُتَّ**
obtexit, operuit.

مُتَّ, ar. سَجَرَ, fut. **مُتَّ**
accendit, calefecit, combussit,
inflammavit, incendit; trop.
concitavit; it. intr., defluxit;
descendit, abiit; exarsit. **مُتَّ**
مُتَّ ab alto delapsa est. Part.
act. præs. **مُتَّ**; subst. stag-
num. Part. pass. **مُتَّ**; ar-
dens.

Ethpe. **مُتَّ** pass.; it. ivit,
abiit.

Pa. **مُتَّ** descendere fecit;
accendit.

Ethpa. **مُتَّ** incensus est.

Aph. **مُتَّ** dimisit; descendere
fecit.

مُتَّ accensio.

مُتَّ ardor.

مُتَّ incensor; it. al. **مُتَّ**
insipidus.

مُتَّ et **مُتَّ**, c. seq. **مُتَّ**
cursus aquæ; canalis; it. pro-

مُتَّ, amygdala.

مُتَّ terebinthus.

مُتَّ et **مُتَّ** gingiva.
مُتَّ accidens repentinus.
مُتَّ jugum textoris.
مُتَّ et deriv., v. s. **مُتَّ**.
مُتَّ, ar. سَجَسَ, fut. **مُتَّ**
et **مُتَّ** agitavit, commovit;
turbavit, concitavit; it. in-
trans. tumultuatus est, rebel-
lavit. Part. pass. præt. **مُتَّ**;
subst. tumultus.
Ethpe. **مُتَّ** pass.
Pa. **مُتَّ** conturbavit, commo-
vit, permovit; blanditus est.
Ethpa. **مُتَّ** conturbatus
est; **مُتَّ** se prælio
miscuerunt hostes.
Aph. **مُتَّ** conturbavit, dece-
pit.
مُتَّ turbatio, adulatio.
مُتَّ, c. suff. **مُتَّ**, tur-
batio, agitatio, perturbatio;
tumultus, seditio; trop. per-
turbatio animi, angustiæ.
مُتَّ perturbator.
مُتَّ perturbatio.
مُتَّ cum tumultu.
مُتَّ perturbatio; blanditiæ.
مُتَّ perturbatio, excitatio;
blanditiæ.
مُتَّ blanditiæ, deliciæ.
مُتَّ perturbator.
مُتَّ irritatio.

تَعْرِمَةً turbulentus, perturbator; adulator.

تَعْرِمَةً perturbatus.

تَعْرِمَةً perturbatio.

ثُوشٌ thos (*gall.* chacal).

فَخْنَانٌ etc., v. s. **فَخْنَانٌ**.

جَهْبَرٌ, fut. **جَهَبَرًا** jecit, projectit, præcipitavit; jaculatus est, seq. **أَنْجَوَا** vel *absol.* dejicit, prostravit; ejicit, expulit, relegavit. **جَهَبَرًا تَعْمَلَ حَمْدًا** se projectit in mare. **أَنْجَوَا مَهْلَلًا** uti tela verba *malitiae* projecerunt. **جَهَبَرًا فَحْسَبَ** indulxit cupiditatibus suis. **جَهَبَرًا مَهْلَلًا** saliit, subsiliit. *Part. act.* **جَهَبَرًا وَهَمْسَةً**, **جَهَبَرًا**; *subst.* **جَهَبَرًا** aquæductus; f. **جَهَبَرًا** *subst. v. infra*. *Part. pass.* **جَهَبَرًا**. *Ethpe.* **جَهَبَرًا** jactus est, ejacutus est; se jecit, c. **كَلَّا**.

Pa. **جَهَبَرٌ** jecit, projectit; dejicit; rejicit, repudiat.

Ethpa. **جَهَبَرًا** *pass.*

Aph. **أَجْهَبَرٌ** jecit, ejicit; dimisit; **أَجْهَبَرْ وَحْشَتِي**, c. **كَلَّا rei**, attente consideravit, studuit. *Part. act.* **جَهَبَرًا**; *subst. v. infra*.

et جَهَبَرًا *jactatio, projectio.*

جَهَبَرًا, pl. **جَهَبَرَاتٍ** hasta brevis, jaculum.

جَهْبَرًا amictus pontificis seu sacerdotis.

جَهْبَرًا, ap. Orient. **جَهْبَرًا**, jactus, projectio. **جَهْبَرًا أَنْجَوَا** it. **جَهْبَرًا** **جَهْبَرًا** jactus jaculi, jactus arcus; *trop.* distantia jactus jaculi, etc.

جَهْبَرًا, st. cst. **لَبَّى**, locus, dignitas, munus; *cfr. ar.* **جَهْبَرًا** sedes.

جَهْبَرًا fructus myristicæ moscatæ.

جَهْبَرًا, fut. **جَهْبَرًا** fundavit *aedificium*; donum dedit sponsus sponsæ.

Pa. **جَهْبَرٌ** ut *Pe.*

جَهْبَرًا fundamentum; profunditas; munera sponsalitia, *per extens.* desponsatio, coniugium.

جَهْبَرًا, fut. **جَهْبَرًا** ut *communius Pa. Part. pass.* **جَهْبَرًا**; blandus.

Pa. **جَهْبَرًا** blanditus est, seduxit, decepit; induxit ad. **جَهْبَرًا** **بَغْفَى** bono animo esto.

Ethpa. **جَهَبَرًا** *pass.*

جَهْبَرًا illectamentum, blandimentum; blanditiæ.

جَهْبَرًا adulatio.

مَهْوُلٌ et مَهْوَدٌ adulatio, blanditiæ ; deceptio.

مَهْلَكٌ adulator, deceptor.

مَهْلَكٌ adulator.

مَهْلَمَةٌ blande, comiter.

جِنْيٌ, pers. - ar. شَادَرْجَةٌ, hæmatites lapis.

مَهْوَمٌ, vox ar. سُنْسٌ, pars sexta.

مَهْبَةٌ, inus. — Pa. مَهْبَةٌ dimisit, misit, emisit verba ; mandavit. مَهْبَةٌ مَهْبَتْهُ nuntiari jussit alteri. مَهْبَةٌ مَهْبَتْهُ id. مَهْلَكٌ occidi jussit. مَهْلَكٌ امْهَلَهُ arcessivit eum. لَا مَهْبَةٌ حَمْهُمْ لَا مَهْلَكٌ حَمْهُمْ حَمْهُمْ noli jumentum tuum in pratum non septum mittere.

Ethpa. مَهْمَدٌ pass.

مَهْوَفٌ missio, legatio; permissio.

مَهْوَفٌ missio.

مَهْوَفٌ مَهْوَفٌ missio accepta.

مَهْوَفٌ مَهْوَفٌ missio data.

مَهْبَأٌ, v. s. جِنْيٌ.

١٠٣ et مَهْلَكٌ, fut. مَهْلَكٌ defecit, languit, deferbuit ; desertus fuit locus ; it. aberravit, cfr. لَهْلَكٌ et ar. شَاهَ.

Part. pres. مَهْلَكٌ ; مَهْلَكٌ nausea captus est. Part. pass. لَهْلَكٌ, لَهْلَكٌ, f. emph.

مَهْمَمَةٌ frigidus, deficiens ; desertus, inhabitatus.

Ethpe. مَهْمَدٌ defecit.

Pa. مَهْلَكٌ refrigeravit, extinxit ; lenivit ; trop. restinxit, repressit ; sedavit. مَهْمَمَةٌ مَهْمَمَةٌ كُنْ وَهَمْلَهَا te supplices exoramus ut fleetas.

Ethpa. مَهْمَدٌ pass. ; it. defecit, diminutus est ; مَهْمَمَهُ لَا مَهْمَمَهُ ne te nimium emollire sinas odorum oblectamentis.

Aph. مَهْلَكٌ refrigeravit.

مَهْلَكٌ, مَهْلَكٌ deliquium ; مَهْلَكٌ وَهَدْلَهَا ignis extinctio ; it. ut seq.

مَهْلَكٌ desertum.

مَهْلَكٌ deliquium animi.

مَهْلَكٌ refrigeratio, sedatio ; desertum.

مَهْلَكٌ refrigerans, sedans.

مَهْلَكٌ frigus.

مَهْلَكٌ مَهْلَكٌ refrigeratio ; res-tinctio, sedatio.

مَهْلَكٌ, pers. شَاهَبَاز, falco.

مَهْلَكٌ, pers. شَاهَدَبَير, scriba regis.

مَهْلَكٌ, vox pers. شَاهَدَرْجَةٌ, semen cannabis.

مَهْلَكٌ ut مَهْلَكٌ.

مَهْلَكٌ, ar. أَشْهَلٌ, niger in cœruleum vergens.

شَاهِنْزَادَهْ مُهَمَّهْ بَهْ, pers., *margarita regis planta.*

خَاهَهْ مَهْ وَخَاهَهْ مَهْ, pers., ar. شَاهِنْبَزْرَمْ, *ocimum basilicum.*

وَهْ مَهْ, ar. سَبَرْ, fut. نَهْ مَهْ vigilavit.

مَهْ مَهْ vigilia, excubiae, vigiliae sanctae; alimenta in defunctorum memoriam oblata.

مَهْ مَهْ vigil, excubitor; qui praeest vigiliis nocturnis in choro.

مَهْ مَهْ مَهْ مَهْ pl. مَهْ مَهْ مَهْ vox pers., magnates officiales primarii regis.

مَهْ مَهْ pers., platea.

لَهْ مَهْ, heb. הַוָּ, ar. سَوِيْ, fut. نَهْ مَهْ æqualis, par fuit; dignus fuit, meritus est; it. valuit, constitut res. مَهْ مَهْ مَهْ æqualiter se extendit. Part. præs. مَهْ مَهْ; st. c. f. مَهْ مَهْ; conveniens, dignus, accommodatus. مَهْ مَهْ مَهْ retributionem merentur. مَهْ مَهْ مَهْ res quam fateri et laudare decet. Part. præt. مَهْ مَهْ pl. مَهْ; par, æquus, dignus, pretio æquivalens. مَهْ مَهْ لَهْ مَهْ

جَهْ جَهْ بَلْ تَهْ دَهْ مَهْ وَهْ مَهْ in eo est humilitas cordis ut minus æquo quis de se sentiat; subst. in pl. emph.

مَهْ مَهْ puncta diacritica sententiæ, apud Orientales لَهْ مَهْ vocata, in hunc modum (:) posita ad separanda protaseos membra; مَهْ مَهْ مَهْ مَهْ pares consilio: consiliarii; st. emph. f. مَهْ مَهْ, subst. æqualitas, mediocritas; adverb. مَهْ مَهْ pariter; mediocri pretio; it. مَهْ مَهْ simul.

Ethpe. مَهْ مَهْ par, dignus factus est; obtinuit; adhaesit, se conjunxit; c. لَهْ مَهْ vel حَهْ مَهْ consensit, conspiravit, c. لَهْ مَهْ rei. مَهْ مَهْ مَهْ مَهْ tecum consentimus.

Pa. مَهْ مَهْ æquavit, composuit, complanavit, conjunxit; stravit lectum, etc.; detersit; trop. reconciliavit; مَهْ مَهْ مَهْ مَهْ se stravit ad dormendum. مَهْ مَهْ مَهْ مَهْ حَهْ مَهْ مَهْ مَهْ inter fratres reconciliavit حَهْ مَهْ مَهْ مَهْ مَهْ cuilibet rei par sum ego. مَهْ مَهْ مَهْ مَهْ حَهْ مَهْ مَهْ مَهْ si mecum conjungi vis, camus. Part. pass. مَهْ مَهْ مَهْ مَهْ subst. f. emph. مَهْ مَهْ مَهْ nomen metri poetici, quod sexdecim

*syllabis in quatuor partes
æqualiter divisis constat.*

Ethpa. اَثْدَادُ stratus est.

Aph. اَهْمَلَ æquavit, coæquavit,
c. اَكَ pers. composuit, com-
planavit; parem, dignum fe-
cit vel judicavit. حَسْرَمَقْعَدًا اَحْمَدَدُ اَنْمَهْ دَكْدَهْ
اَنْخَهْ pari sollicitudine et
ratione ducant omnia hæc.
حَفْدَهْ اَمْبَهْ لَأَنْمَهْ
facient; seq. al. verbo æqui-
valet adv. una, simul. اَهْمَهْ
اَنْجَهْ simus sagittas con-
jecerunt.

Ettaph. اَتَهْلَكَ pass.

اَهْمَلَ æqualitas, pler. in st. c.
adverb. usurpat. اَهْمَلَ æquali-
ter, pariter; simul. اَهْمَلَ
ex condigno.

اَهْمَلَ æque, pariter, simul,
una. دَكْدَهْ اَهْمَلَ omnes
æqualiter, omnes simul.

اَهْمَلَ coæquatio, conjunctio;
concordia, consensus; æqui-
noctium. حَنْهَهْ اَهْمَلَ linea
æquinoctialis. اَهْمَلَ دَهْنَهْ اَهْمَلَ
nominis appellationisque si-
militudo. اَهْمَلَ حَنْهَهْ وَأَكْهَهْ
æqualitas divinæ essentiæ
in Trinitate. اَهْمَلَ نَفْقَهَا
animorum concordia. اَهْمَلَ
لَهْلَهْ concursus; adverb.

حَمْنَهْ اَهْمَلَ et حَمْنَهْ una simul.
اَهْمَلَ اَهْمَلَ aequalis.

اَهْمَلَ manubrium securis, etc.;
hostile.

اَهْمَلَ funiculus mensorius; it.
al. اَهْمَلَ, vilitas pretii. اَهْمَلَ
وَقْهَهْ filum ferreum.

اَهْمَلَ jugum textorum.

اَهْمَلَ girgillus textoris (*gall.*
dévidoir).

اَهْمَلَ stratum, pavimentum.

اَهْمَلَ et اَهْمَلَ stratum;
lectus.

اَهْمَلَ meritum.

اَهْمَلَ, ar. شَوَّال decimus men-
sis anni Moslemorum.

اَهْمَلَ, fut. نَفَقَ æstuavit,
aruit, exsiccatus est.

Aph. اَهْمَلَ exsiccavit, torruit.
اَهْمَلَ æstus; uredo; ventus
urens, *cfr. neo-ar.* شَرْب *id.*

اَهْمَلَ æstus, ventus urens.

اَهْمَلَ æstu exsiccatus, aridus,
sterilis; rubiginosus.

اَهْمَلَ æstus, uredo; venti
urentes.

اَهْمَلَ canalis, ar. سَبَب *id.*, a
fluxit.

اَهْمَلَ dux militiæ.

اَهْمَلَ, fut. نَفَقَ, pur-
gavit; it., ut لَهْلَهْ, erravit.

مَهْمَدَةً incerne (*gall.*
passee dans un tamis).

Ethpe. مَهْمَلَةً lotus est.

Aph. مَهْمَلَةً abluit, lavit. *Part.*
pass. مَهْمَلَةً ; *f.* *emph.* et *subst.*
مهْمَلَةً *v.* *infra.*

مَهْمَلَةً, *emph.* مَهْمَلَةً ablutio,
lotura. مَهْمَلَةً وَتِسْعَةً مَهْمَلَةً intinctio
æris (*gall.* trempe).

مَهْمَلَةً omnis vestis tenuis.

مَهْمَلَةً pelvis, lavacrum.

مَهْمَلَةً lanea vestis ; *in pl.*
مهْمَلَةً æris intinctio.

مَهْمَلَةً, *ar.* سَاجَةٌ, platanus, lignum
tectoniæ grandis.

مَهْمَلَةً, *v. s.* مَهْمَلَةً.

مَهْمَلَةً, *fut.* مَهْمَلَةً vagatus est,
huc illuc circuivit ; flavi-
vit ; *it.* *trans.* effudit, *cfr.*
مهْمَلَةً.

مَهْمَلَةً primæ frumenti spicæ con-
culturatae.

مَهْمَلَةً, *c. deriv.*, *v. s.* *rad.* مَهْمَلَةً.

مَهْمَلَةً, *v. s.* مَهْمَلَةً.

مَهْمَلَةً, *forma Schaph.* *rad.*
inus. مَهْمَلَةً, *ar.* وَزَبَ fluxit,
proprie elapsus est, evasit,
inde *syr.* evadere fecit, libe-
ravit ; servavit ; *apud* *alios*
tamen ab assyr. *vel chald.*

Ethpa. مَهْمَلَةً *pass.*; *it.* fugâ se

subduxit, confugit ad, *c. v.*
مهْمَلَةً et مَهْمَلَةً liberatio, refu-
gium.

Mَهْمَلَةً liberator, salvator.

مَهْمَلَةً liberatio, salvatio.
مهْمَلَةً حَفْرٌ مَهْمَلَةً وَحْدَهُ
ut insigni liberatione vos vi-
vificet.

مَهْمَلَةً liberator.

مَهْمَلَةً liberatio, actus libe-
randi.

مَهْمَلَةً, *fut.* مَهْمَلَةً ortus est,
germinavit, effloruit.

Aph. مَهْمَلَةً oriri fecit, ger-
mine fecit.

مَهْمَلَةً et مَهْمَلَةً germinatio, ger-
men, ortus.

مَهْمَلَةً germinatio.

مَهْمَلَةً, *ar.* سَاجَةٌ, *fut.* مَهْمَلَةً
liquefactus est, difluxit ; ta-
buit ; languit. *Part.* *præt.*

مَهْمَلَةً, *tabescens* ; *it.*
subst., *heb.* שָׁבֵד, puteus : ca-
verna ; artemisia *planta*, *ar.*
شَبَدٌ.

Aph. مَهْمَلَةً liquefecit ; trop.
emaciavit, languidum redi-
didit ; *intrans.*, ausus est, audax,
strenuus fuit ; restituit,
c. v.

مَهْمَلَةً liquefactio ; audacia.

دَمْسَى et دَمْسَى debilitatio.
 دَمْسَى liquefactus, languens.
 دَمْسَى , pl. دَمْسَى regio.
 دَمْسَى audax.
 دَمْسَى audacia, insania ;
 lascivia, cfr. دَمْسَى .
 دَمْسَى insulsus, insipidus.
 دَمْسَى liquefactio, audacia.
 دَمْسَى , v. s. دَمْسَى .
 دَمْسَى , v. s. دَمْسَى .

دَمْسَى, fut. دَمْسَى contempsit,
 sprevit. Part. pass. دَمْسَى ; vilis;
 subst. in pl. دَمْسَى virgæ ; f.,
 emph. et subst. دَمْسَى ramus
 myrti, pl. دَمْسَى .
Ethpe. دَمْسَى pass.
Aph. دَمْسَى ut Pe.
 دَمْسَى , heb. شَوْرَت , ar. سَوْط ,
 scutica, flagellum.
دَمْسَى contemptus, heb. שָׁאֵל ;
 it. uleus ciliorum.
دَمْسَى contemptor.
دَمْسَى contemptus, spretio.
دَمْسَى contemptibilitas.
دَمْسَى contemptim.
دَمْسَى contemptus, spretio.
 دَمْسَى , vox ar. شَوْك , spina, vep-
 res.

دَمْسَى - Aph. دَمْسَى dolorem
 produxit, sauciat, afflixit.

دَمْسَى , pl. دَمْسَى dolor, vulnus,
 cicatrix ; fragmentum panis ;
 pili pubis.
دَمْسَى pars corporis superior.
دَمْسَى nocens, affligen ; pl. f.
 دَمْسَى damna, luctus.
دَمْسَى dolor, damnum, nocu-
 mentum.
دَمْسَى vitex arbor ; it. al.
 sensu v. s. دَمْسَى .

دَمْسَى, fut. دَمْسَى oblevit,
 obduxit ; intrans., oclusus
 est auditus, oculus. Part.
 pass. دَمْسَى ; trop. incircumci-
 sus, impudens.
Ethpe. دَمْسَى pass.
Aph. دَمْسَى oblevit.
 دَمْسَى , ar. سِيَاء , litura ; pix.
دَمْسَى vane, temere.
دَمْسَى procacitas, temeritas.
دَمْسَى albugo oculi,
 دَمْسَى petra, lapis, saxum ; trop.
 homo durus.
Etthaph. دَمْسَى v. denom., la-
 pis factus est, in saxum mu-
 tatus est.
دَمْسَى saxeus, durus ut lapis.
دَمْسَى petrificatio ; lapidea
 duritia.
دَمْسَى, st. c. دَمْسَى , pl. دَمْسَى , ar. سَاعَة , ho-
 ra, momentum temporis ; ad-
 verb. دَمْسَى nunc; ad tempus. دَمْسَى

وَمُدْعِيٌ statim; حَتَّىٰ مُدْعِيٌ horologium.

مَدْعُونٌ *et deriv., v. s.* **مَدْعَى**.

عَدَ, *fut.* **عَدَفَ** obduxit,
illevit, inunxit, fricuit, lima-
vit, polivit, sculpsit; *intrans.*,
reptavit; recubuit, incubuit.

Part. pass. مُفْعَلٌ; *subst.* *pasta.*
Ethpe. مُفْعَلٌ *obductus est,*
limatus est.

Pa. **هَمْكَ** fricuit, illevit, mul-
sit. *Part. pass.*; **هَمْكَفُ** tenuis.

Aph. **عَدَّل** fricuit, polivit; purificavit, mundavit; *trop.* blanditus est, misertus est, c.
عَذَّبَ pers.

¶ locusta adhuc repens non-
dum alata.

لَعْنَد actus perfricandi, poliendi, frictio, politio ; limatura ; astrologia ; fucus ; incubatio.

دِهْنَةُ وَمَهْنَةُ dysenteria.
دِهْنَةُ وَسَنَةُ canalis nasi.

لِمَّا *v. s.* **لِمَّا** .
لِمَّا *lima.*

حُنْفًا, pl. **حُنَفَاتٍ** illitio, collyrium: purgamentum.

لِمَاتُرَا limatura; gummi liquidum.

¶ **limator**, sculptor; sterilis
annus.

فِرْقَةٌ frictio; refrenatio.

لِهَفْكُ hiera, medicamenti
genus.

مَهْوَفْتُمْ, f. **مَهْوَفْتَمْ** turtur.

مَسْفَلٌ clare.

مَوْهِفٌ، v. s. مَوْهِفٌ .

أَبْهَرَ - *Aph.* **أَبْهَرَ** abhorruit,
c. **أَبْهَرَ** recusavit.

مَدْهُومٌ, *heb.* פָוֵשׁ, *ar.* مَوْقِعٌ, *forum,*
platea, vicus; *it.* claustrum.
مَدْهُومٌ *foras.*

مَهْمَّة forensis ; it. vulgaris,
cfr. ar. شُوقَّي id.

مُعْدَّا, pler. f., heb. פָּזַן, ar. ساق, pl. مُعْدَّات, crus, tibia; fovea, fossa; trop. stirps, radix trunci arboris, origo generis.

سَارَ, ar. سَارَ, يُسَارُ, fut. سَارَةٌ saliit, insiliit, exsiliit, prosiluit; prorupit, scaturivit; transiliit, fugit: offendit, adortus est, contendit, c. **لَهُ**.

Pa. ؛ مَلِكٌ saliit, exsiliit; ad
opus se accinxit. *Part.* *pr̄s.*
؛ مَلِكٌ ، إِشْرَاعٌ saltans, exsi-
liliens.

Aph. ;^{aa} salire fecit, transiliare fecit: sustulit.

Ethpa. ִוְדָאַל subsiluit.

لُجْهَةٌ, emph. لُجْهَةٌ saltus, saltatio; chorea.

مَهْوَا actus transiliendi, propulsio; collectio; cincinnus.

مَهْوَا murus, moenia, *cfr. شَرْ وَ et مَهْوَا* سُورٌ; *it.* rota; *بَيْكِيلَةً* rota curriculi; *نَهْوَا* ante-murale; *it. v.* نَهْ . **مَهْنَا** pulviseulus.

مَهْنَا turma; agmen viatorum (*gall.* caravane).

مَهْوَفْ usitat. *in Ethpe.*; *forma Schaph.* verbi inus. مَهْنَه , ar. وَرَى , erupit ignis, et compactus fuit.

Ethpe. اَهْكَاهْ erupit, prodiit; apud astron, in conjunctio-nem venit; *it.* aestuavit; confli-xit cum, seq. حَلَّ ; *it., ar.*

إِسْتَوْرَى , se occultavit; erravit.

مَهْنَهْنَهْ conjunctio.

مَهْوَصْنَهْ, *v. s.* مَهْنَه .

مَهْوَفْلَهْ, *v. s.* حَلَّ .

مَهْلَهْ, *inus.* — **Pa.** مَهْلَهْ , ar. شَوْشَ , miscuit, confudit, conturbavit.

مَهْلَهْ turbatio.

مَهْمَهْا confusio, permixtio.

مَهْمَهْ, ar. سُوسٌ , tinea.

مَهْمَهْ, *fut.* مَهْمَهْ quietus, tranquillus, stabilis fuit.

Pa. مَهْمَهْ quietum, tranquillum reddidit, stabilivit; sedavit,

compressit *iram, passionem*; *cfr. ar.* شَانْ politice egit.

Ethpa. اَهْكَاهْ pass.

مَهْمَهْنَهْ socius sponsi; sponsor, patrinus, *heb.* شَوْبَهْ , *neo-ar.* شَيْنَ patrinus; *f.* مَهْمَهْنَهْ so-cia sponsae, *pl.* مَهْمَهْنَهْ et مَهْمَهْنَهْ .

مَهْمَهْنَهْ officium sponsoris.

مَهْمَهْنَهْ ad sponsores perti-nens.

مَهْنَهْ, etc. *v. s.* مَهْنَهْ .

مَهْنَهْ grunnivit sus.

مَهْلَهْلَهْ *f.*, *pl.* مَهْلَهْ lumbricus, vermis intestinorum (*gall.* ténia), *cfr.* مَهْلَهْ .

مَهْلَهْ, ar. سِسَهْ , sesamum.

مَهْلَهْ, ar. فَرْمَهْ , formica.

مَهْلَهْ *f.*, emph. مَهْلَهْ , *f. pl.* مَهْلَهْ , *heb.* حَنْشَ , ar. سَوْنَنْ , lilium. مَهْلَهْ nymphaea planta (*gall.* né-nuphar). مَهْلَهْ مَهْلَهْ lilium convallium. مَهْلَهْ مَهْلَهْ lilium hortense.

مَهْلَهْ equarius, *cfr.* مَهْلَهْ (ar. سَارِسْ , *gall.* palefrenier).

مَهْلَهْ *f.*, linteum, mantile, velum muliebre; *cfr.* مَهْ laevigavit.

مَهْلَهْ, assyr. sutapu, socius,

consors ; maritus, *f.* مَوْاْفِدًا
socia ; conjux.

Pa. مَوْاْفِدًا *v. denom.*, consociavit, communicavit, *c.* مَوْاْفِدًا *pers.* participem effecit; addidit.

Ethpa. مَكْوَافِدًا *pass.* et *refl.* ; coivit *c.* muliere. مَكْوَافِدًا حَسْمًا خَعْ alicujus commiserans. مَهْمَادًا دَحْتَدًا bonis operibus adhæserunt.

مَهْمَادًا participatio, communio ; coitus ; *ap. gramm.*, participium.

مَهْمَادًا consociatio ; مَهْمَادًا مَهْمَادًا commiseratio, sympathia.

مَهْمَادًا, *it.* خَمْرًا zizyphum rubrum (*gall.* jujubier).

لَمَّا, *heb.* לְמַמֵּשׁ, *fut.* لَمَّا liquefactus est, effluxit, difluxit ; marcuit, languit.

Aph. لَمَّا liquefecit, marcescere fecit ; *intrans.* defecit.

لَمَّا et لَمَّا, *pl.* لَمَّا مَهْمَادًا axilla ; *cfr. neo-heb.* شׂ id.

لَمَّا, *pl.* لَمَّا مَهْمَادًا obsonium seu condimentum paratum cum aceto ; *it.* ramus ; virga arboris.

لَمَّا, *heb.* לְמַמֵּשׁ, *fut.* لَمَّا liquefactus est, effluxit, difluxit ; marcuit, languit.

munere corruptus *judicem etc.* ; donavit, muneratus est.

Pa. لَمَّا largitus est, liberatiter donavit, muneribus sibi conciliavit *judicem*.

Ethpa. لَمَّا muneribus gratificatus est, donis cumulatus est ; corruptus est.

لَمَّا, *st. abs. et est.* لَمَّا, *pl.* مَهْمَادًا donum, spec. munus judici datum ; lucrum.

لَمَّا donator, muneribus *judicem* corrumpens.

لَمَّا, *fut.* لَمَّا liquefactus est ; tabuit.

Aph. لَمَّا liquescere fecit.

لَمَّا, *heb.* לְמַמֵּשׁ, *m.* لَمَّا, *fut.* لَمَّا corruptus est.

Pa. لَمَّا corruptus est, perdidit ; delevit, dissipavit ; stupravit, *virginem* defloravit.

Ethpa. لَمَّا *pass.* لَمَّا corruptio ; *it.* nomen morbi.

لَمَّا et لَمَّا corruptor, stuprator, vastator, sicarius.

لَمَّا corruptio ; stuprum.

لَمَّا modo inquinato, fœde.

لَمَّا, *ar.* لَمَّا, *fut.* لَمَّا fluxit, stillavit ; diffluit, lique-

factus est; *trop.* cessavit, supercedit *a re*; *it. trans., fut.*

~~W~~ percolavit. Part.
præs. act. ~~W~~; subst. v.
infra.

Ethpe. ~~καὶ~~ diffuit, tabuit,
limavit.

*Pa. ~~mixtum~~ fluere fecit, liquefecit;
percolavit, purgavit aurum.*

Ethpa. ~~�~~ purgatus est;
se effudit; *trop.* indignatus
est, c. ~~�~~.

Aph. ~~visus~~ fluere fecit; effudit lacrymas; solvit, liquefecit, purgavit; tabescere fecit.

fluxus, torrens.

سِلْكِيْدَم stillicidium, lacryma.

ئەللىم effluvium; stilla, stillicidium; flumen, cisterna: column; fæx, lutum.

مَكْوَبٌ dim., rivulus.

لَعْنَدُ, pl. **لَعْنَدَاتٌ** lacy-ma.

fluxus; defæcatio lactis, etc.

النّ patina ; colum.

مَدْكُورٌ et deriv., v. s. rad.
مَدْكُورٌ.

P-aa, ar. ፩፻, fut. ፩፻
niguit : it periit : it ፩፻

ingratu, *a.* *perit*, *a.* ~~perit~~,
ar. ~~perit~~, *fut.* ~~perit~~ *pinguis*
exasit. *Pant* *enras* | ~~perit~~

nigricans subniger Part

præt. ~~Læs~~ *adj.* et *subst.*
v. infra.

Pa. ~~ex~~ fuscavit, subnigrum fecit; denigravit, infamavit; polluit, inquinavit, violavit; *it.* simplicem efficit.

*Ethpa. ~~iratus~~ pass. ; trop.
iratus est.*

Aph. ~~مُسَكِّن~~ fuscavit, nigrum
effecit: denigravit.

جَوْسَهُ *arbutus.*

~~lutea~~ color fuscus.

مَسْنَد, **مَسْنَد**, **مَسْنَد**, fuscus, subniger;
pinguis, sincerus, purus, simplex, merus; absolute sumpta vox; vilis, vulgaris, communis; profanus, laicus;
مَسْنَد مَسْنَد miles
gregarius. **مَسْنَد** مَسْنَد dies
ferialis. **مَسْنَد** مَسْنَد ci-
bus simplex non lautus;
subst. in f. emph. **مَسْنَد**,
Officium feriale apud Maronitas.

أَمْمَةٌ مُّسْلِمَةٌ simpliciter, mere ;
absolute, communiter ; sto-
lide ; *it.* quomodocumque, ul-
tro.

Lamia fuscus color, nigredo: simplicitas.

مُنْهَى denigratio; atramen-tum.

la interjectionem, dolorem exprimens.

مس, ar. سَخَنْ, fut. نُفْسْ calefactus est, se calefecit. مَدْحُورٌ مُفْسِدٌ تَهْوِي sedebat et ad ignem se calefaciebat.

Pa. مَشْ calefecit, fovit; ulceravit; inebriavit. *Part. pass.* مَعْكُسْ; ulcerosus.

Aph. مَسْ calefecit.

Ethpa. مَعْكُسْ calefecit se, refectus est, refovit se; incensus est desiderio; commotus est; inanis factus est.

مَعْكُسْ, heb. מַעֲקָשׁ, ulcus, vulnus, مَعْكُسْ سَكْلَة cancer morbus. (gall. variole). مَعْكُسْ آانْتَ apostema, ulcus in capite. مَعْكُسْ حَنْدًا وَمَعْكُسْ بَرْدًا vir ulceribus affectus. مَعْكُسْ حَمْمًا ulcus perniciosum: elephantiasis morbus.

مسنعاً cancer.

مسنعاً ulcerosus.

مسنعاً calefactio; unguentum, emplastrum.

مسنعاً, مَسْ calefactus calidus; it. calefaciens, refovens; subst. in pl. aqua calida.

مسنعاً calor, aestus.

Ethpaial مَعْكُسْ ئِنْسَانٍ insanivit; cfr. مَعْكُسْ ئِنْهَا.

مسنعاً polenta, ar. سَجْنَة.

مسنعاً, ar. شَحْنَة, pers. شَحْنَة, præses, prætor; præsidium urbis.

مسنعاً مَعْكُسْ ئِنْهَا calefactio.

مسنعاً مَعْكُسْ colostrum.

مسنعاً, heb. מַחְנֵשׁ, ar. سَخَنْ, fut. نُفْسْ trivit, contrivit, comminuit, concussit; consumpsit; trop. infestavit, vexavit, conturbavit. affixit; it. laboravit, operam dedit; præparavit, composuit. *Part. pass.* مَسْكُسْ contritus; trop. animo contritus; it. laboriosus; ærumnous.

Ethpe. مَعْكُسْ pass.; operam dedit; iratus est, c. حَنْدًا. مَعْكُسْ ئِنْهَا eum pœnituit de peccatis, ar. إِنْسَخَنْ.

مسنعاً مَعْكُسْ vexatio, angustiæ, ærumna: vituperatio acerba.

مسنعاً aflictio, ærumna.

مسنعاً ut مَسْكُسْ.

مسنعاً pelicanus.

مسنعاً مَسْكُسْ pigmentum.

مسنعاً, heb. מַחְנֵשׁ, fut. نُفْسْ niger, obscurus fuit vel fac-

tus est ; *trans.*, irriguit, *c.* مُسْنَ ;
pers., contempsit, *ar.* سَخَرَ ;
it. vitriolum adhibuit. *Part.*
præs. مُسْنَ ; *subst.* *v. infra.*
Pa. مُسْنَ denigravit, obseurum
 fecit, *cfr. neo-ar.* سَخَرَ ; *trop.*
 infamavit ; *it. ar.* سَخَرَ , co-
 egit, angariavit.

Ethpa. مُسْنَ pass. ; *it. forma-*
rad. مُسْنَ , *q. v.*

مُسْنَ , *v. ibid. s. مُسْنَ .*

مُسْنَ nigredo, caligo, tenebræ ;
it. coll., grex, *spec. porcorum,*
dæmoniorum, impiorum ; *trop.*
 مُسْنَ وَ مُسْنَ grex seu sec-
 ta Bardesanis.

مُسْنَ cophinus frugum jumento
 impositus.

مُسْنَ vitriolum. مُسْنَ vitriolum rubrum. مُسْنَ
 vitriolum sutorum (gall. couperose).

مُسْنَ , usit. *in. pl.* مُسْنَ , *it.*
emph. مُسْنَ nigredo ; car-
 bones.

مُسْنَ spurius, corruptus ; im-
 postor ; *it. al.* مُسْنَ , *f.*
 مُسْنَ , *pl.* مُسْنَ asper ;
 difficilis via ; *subst.* clivus.

مُسْنَ et مُسْنَ angariatio ;
 corruptio, pravitas.

مُسْنَ angariatio.

مُسْنَ denigratio, fuligo ; car-

bones, *it. cfr. pers.* سَكَر car-
 bo ardens ; *trop.* fœditates ;
it. c. al. sensu , *v. s. مُسْنَ .*
 مُسْنَ , *ar.* سَخَرَ merula avis
 (gall. merle).
 مُسْنَ mandragora.

أَرْجَعَ , *heb.* شَهَّ , *fut.* مُسْنَ
 aeruginem contraxit ; corruptus est, periit.

Aph. مُسْنَ aerugine afficit ;
 corruptit ; *it. impers.* مُسْنَ
 aeruginem contraxit.

أَرْجَعَ f. , pl. مُسْنَةَ aerugo,
 sordes ; lepra.

أَرْجَعَ et مُسْنَةَ aeruginosus.

أَرْجَعَ lenticula palustris.

أَرْجَعَ acervus.

أَرْجَعَ frumentum frixum,
 polenta, *ar.* سَخَتِيت .

أَرْجَعَ , *fut.* مُسْنَ stultus
 fuit, desipuit ; defecit a fide,
 deliquit, moechatus est ; *c.*
 مُسْنَ , *contempsit. Part. præs.*
act. أَرْجَعَ , أَرْجَعَ , *pl. emph.*
 أَرْجَعَ ; stultus, *f. emph.*
 أَرْجَعَ .

Ethpe. أَرْجَعَ contemptus est.

Ethpa. أَرْجَعَ desipuit ; deli-
 quit, moechatus est, *c. مُسْنَ .*

Aph. أَرْجَعَ desipere fecit, infa-
 tuavit ; *it. contempsit, c. مُسْنَ .*

مَهْمَةٌ stultitia, dementia ; error.

مَهْمَّةٌ, heb. מְהֻמָּה, ar. مَهْمَّةٌ, fut. مَهْمَّهٌ expandit, stravit, complanavit ; intr. se expandit, dilatatus est. Part. pass. مَهْمَسٌ ; extensus, planus. مَهْمَّةٌ expansio, latitudo ; distantia, spatium ; platea, forum. مَهْمَّهٌ domus campestris ; impluvium.

مَهْمَّةٌ expansio ; propagatio ; propago ; affluentia.

مَهْمَّةٌ æqualitas, planities. مَهْمَّةٌ latitudo, extensio, planities, platea. مَهْمَّهٌ locus ad expandendum retia ; it. مَهْمَّةٌ retia expansa.

مَهْمُدٌ locus ubi piscantur testudines.

مَهْمَهٌ durus, induratus, asper.

مَهْمَّهٌ, ar. شَاطِي, littus maris, ripa fluvii.

مَهْكَمَهٌ, al. مَهْكَمَهٌ, scertrum.

مَهْكَمَهٌ, fut. مَهْكَمَهٌ fudit, diffidit. Part. pass. مَهْكَمَهٌ ; obliquus ; subst. medicamenti genus.

مَهْكَمَهٌ fissio; debilitatio.

مَهْتَفَهٌ, pl. مَهْتَفَهٌ et مَهْتَفَهٌ alabastrum, pixis aromatica.

مَهْتَهٌ, fut. مَهْتَهٌ desipuit, erravit ; insulsum fuit verbum, insanivit.

مَهْتَهٌ et مَهْتَهٌ chirographum ; syngrapha, cfr. ar. سَطْرٌ scriptio. مَهْتَهٌ وَأَحْيَهٌ instrumentum emptionis.

مَهْهَهٌ وَأَهْهَهٌ et مَهْهَهٌ stultus, insanus. مَهْهَهٌ وَأَهْهَهٌ insane, vane.

مَهْهَهٌ وَأَهْهَهٌ stoliditas, insipientia, ineptiae.

مَهْهَهٌ, v. s. مَهْهَهٌ .

مَهْهَهٌ, heb. מְנִינָה, inferi : per extens., sepulcrum.

مَهْهَهٌ infernus, inferior.

مَهْهَهٌ, v. s. مَهْهَهٌ .

مَهْهَهٌ honor magnus.

مَهْهَهٌ, v. s. مَهْهَهٌ .

مَهْهَهٌ, ar. شَيْخٌ, senex, senior, judex.

مَهْهَهٌ pedes locustæ.

مَهْهَهٌ terra culta ; trop. pax : fortuna, prosperitas ; cfr. pers. حَيْثُنَ pax, et شَيْثُنُ humilis et vallis.

مَهْهَهٌ hortulanus ; pacificus.

مَهْهَهٌ pacem fecit. مَهْهَهٌ

مَهْهَهٌ incolumen dimisit eum.

مَهْهَهٌ سَمَاءً وَمَهْهَهٌ animal cicur.

Pa. ^ت *v. denom.*, complanavit,
pacavit; reconciliavit, pacem
egit; *trop.* *tempestatem* seda-
vit. *Part. pass.* ^{لِمَدْهُ} paci-
ficus; cœur avis.

Ethpa. **عَمَّا** *pass. et refl.* ;
pacifice egit ; foedus pepigit.
عَمَّا *pacatio.*

لَا هُوَ بِالْمُحْكَمِ Pax.

بِهِمْ pacifice ; festive.

فَقِيلَتْ pacificans ; pacificus,
mitis, mansuetus.

卷之四

٥٥٩ . حِفْظٌ

جَفْنَةٌ، v. s. جَفْنَةٌ

Lia et Lise, v. s. ፳፻

كَسَّابٌ, ar. *كَسَّابٌ*, pers. *کَسَّابٌ*, oleum sesami.

מְשִׁיר, in st. est. usurp. **מְשִׁיר**
מְשִׁיר et **מְשִׁיר**
שָׁיר הַשְׁזִירִים, pl. **מְשִׁיר** canticum Canticorum.

^{۲۷} *وَمَنْ*, *vide s. وَمَنْ*.

Lāu, pl. Lāu, et Lāu mar-
mor album; ampulla vitrea,
alabastrum.

سَعْدٌ sporta e palmis texta.

לְמַעַן, emph. לְמַעַן, v. לען.

sesum ut **sesame** sesamum.

Juncus junci species.
Juncus s. pl., forma externa cor-
poris, rei; venustas, qualitas;

efr. heb. תִּשְׁפַּח posuit, indidit.
antiquus.

L'antiquitas.

מִתְחַדֵּת, *heb.* מִתְחַדָּה, *fut.* מִתְחַדָּה, recubuit, decubitum ivit, jacuit, dormivit; concubuit, c. **מִתְחַדָּה**; *trop.* occubuit, obiit, defunctus est. *Part.* *præs.* **מִתְחַדָּה**, *defunctus.* *Part.* *præt.* **מִתְחַדָּה**, *id.*

Aph. **أَحْمَدٌ** recumbere, dormire
fecit; concubere fecit; pro-
stravit hostes. *Part.* **أَحْمَدًا**;
subst. v. *infra*.

مَهْدًا somnium.

دَجْنَةٌ coturnix.

مَحْدُودٌ, **مَحْدُودًا** jacens, somno sopitus.

الْمَدْحُودَةُ prostratio; dormitio,
mors.

مَحْتَدٌ cubile; *pl. f.* **مَحْتَدٌ** areolæ. **مَحْمَدٌ** areo-
lae aromatum.

מִתְחַדֵּשׁ, usitat. in part. pass.:
 cfr. chald. מִתְחַדֵּשׁ et heb. מִתְחַדֵּשׁ
 Aph. v. inus. מִתְחַדֵּשׁ, invenit.
 Part. pass. מִתְחַדֵּשׁ, inventus;
 impers. adest. מִתְחַדֵּשׁ
 inventus; أَنْتَ مُخْسِسٌ إِنْ كَانَتْ حَلَّاً أَوْ حَمَّالًا
 semper exstanti justi in terra.
 Ethyc. أَنْتَ مُخْسِسٌ inventus est:

impers. وَلَمْ تَأْتِهِ فَسَرَّ كَبَّ
وَكَهْ هَلَّا أَكْنَاهُ مُتَأَلِّفٌ ne
inveniar contradicens Deo.

Aph. **أَحْدَثَ** *pro inus.* **أَحْدَثَ**,
fut. **أَنْهَى**, *imper.* **أَحْمَقَ**,
infin. **أَمْكَنَهُ**, *invenit, nactus*
est, adeptus est; potuit; **أَمْكَنَهُ** **أَمْكَنَهُ** *nihil potuit*
contra illum, seu non præ-
valuit. **أَمْكَنَهُ** **أَمْكَنَهُ** *هُنَّا* **أَمْكَنَهُ** *quomodo potuit a se*
somnum abigere? *Part.*
أَمْكَنَهُ, **أَمْكَنَهُ** *qui potest;*
possibilis; *impers.* *possibile*
est. **أَمْكَنَهُ** **أَمْكَنَهُ** *omni-*
potens est. **أَمْكَنَهُ** **أَمْكَنَهُ** *insanabilis est.*
أَمْكَنَهُ **أَمْكَنَهُ** *لِيْلَةً* **أَمْكَنَهُ**
impar sum onere imperii fe-
rendo.

مُخْتَدِرٌ, *f. emph.* **مُخْتَدِرًا**, *pl.* **مُخْتَدِرَاتٍ** *inventio; adeptio; inventum, artificium.*

|**لَامِحٌ** inventio; adeptio.

مَهْبِتٌ qui invenit; inventor;
it. possibilis. **مُمْكِنٌ** impossible.

لِمَكْنَةٍ inventio, potentia.

لِمَدْنَه quod inveniri potest.

مَدْلُول *et مَدْلُول*, *ar.* شَكْ , alum-en
(*gall.* alun).

مَعْلُوٌ *et deriv.*, v. **مَلِكٌ**.

جَهَّ, *heb.* יָמַת, *ar.* يَمِتْ, *fut.* يُمْتَأْدِي subsedit, se demisit, descendit, consedit; *domicilium* habuit, inhabitavit.

Pa. مُنْتَهٰ ad pios usus applicuit
rem (*id. q. ar.* وَقَاتٍ), dona-
vit; auxilium præbuit; pacा-
vit. مُنْتَهٰ لِحَمْدٍ نَّا لِمُنْتَهٰ نَّا ne indul-
geas carni.

Ethpa. ὅντις donatus est.

Aph.  *inhabitare fecit,*
stabilivit.

حَيْثُ habitatio; sedimentum.

مُحْدَرٌ *domicilium*; *dæmon hominem possidens; it. sedimentum.*

(*id. q. ar.* وَقْفٌ), concessio, do-

natio; donum, munus, charisma. مهداً و هداً donum
Spiritus: Sacramentum Confirmationis.

جُنْدُونٌ subsidens, inhabitans.

حَكِيمٌ, pl. **حَكَمَتُمْ** sedes, habitation; sedes Dei, thronus Dei, majestas divina; *it.* sepulcrum.

مَهْدَى, *an.* مَنْجِن, **مَهْمَّة** cilium, tabernaculum; **مَهْمَّة** tabernaculum. **مَهْمَّة** أَحْلَى

Tabernaculum temporarium :
Tabernaculum fœderis. ﴿

مَهْمَنْتُ, *ap. Orient.* مَهْمَنْتُ, *pignus*; *in pl.* مَهْمَنْتُ deposita.

Pa. مَهْمَنْتُ *v. denom.*, oppigneravit.

Ethpa. مَهْمَنْتُ *pass. et refl.*

largiens, concedens.

مَهْمَنْتُ largitio, auxilium.

مَهْمَنْتُ oppigneratio.

مدْفُوناً — *Ethpa.* مَهْمَنْتُ involutus est; consumptus est.

مَهْمَنْتُ tegumentum; inunctio.

مَهْمَنْتُ et مَهْمَنْتُ, *or.* شَكَافٌ, sutor.

مَهْمَنْتُars sutoris.

مَهْمَنْتُ res involutae; *al. germina.*

مَهْمَنْتُ, *heb.* شَدَّ, *ar.* سَجَرَ, fut.

fut. مَهْمَنْتُ ineibriatus est, ineibriavit se; *it.* caligavit oculus; deformatus est; fœdus fuit. Part. præt. مَهْمَنْتُ turpis; stultus, absonus.

Pa. مَهْمَنْتُ turbavit, inquinavit; deturpavit, deformem reddidit, depravavit; blasphemavit. Part. pass. مَهْمَنْتُ; turpis.

Ethpa. مَهْمَنْتُ inquinatus est, se inquinavit, deformatus est, turpis fuit; insanuit. مَهْمَنْتُ dementiam simulavit coram eis.

مَهْمَنْتُ ebrietas, turpis actio; convicium.

مَهْمَنْتُ turpis actio; blasphemia.

مَهْمَنْتُ turpitudo, fœditas; pravitas; insania.

سَكَرٌ, مَهْمَنْتُ, *heb.* شَدَّ, *ar.* مَهْمَنْتُ, sicera.

سَيْكَرَاتٌ, مَهْمَنْتُ, *ar.* hyoseynamus planta (*gall. jusquiame*).

مَهْمَنْتُ turpitudo, deformitas.

مَهْمَنْتُ et مَهْمَنْتُ, *pers.-ar.* سَكَرٌ, saccharum.

مَهْمَنْتُ, fut. شَكَافٌ, quiebat, siluit; resedit aqua; it. effugit.

Pa. مَهْمَنْتُ quiescere fecit; turbavit, turbidum reddidit, inquinavit.

Ethpa. مَهْمَنْتُ ad quietem perductus est, quievit.

مَهْمَنْتُ f., lutum, sedimentum, fæx, ærugo.

مَهْمَنْتُ turbidus, fæculentus.

مَهْمَنْتُ requies. بُهْمَنْتُ silentium mortis.

مَهْمَنْتُ et مَهْمَنْتُ quiescens, quietus.

مَهْمَنْتُ turbidus, fæculentus.

مَهْمَنْتُ, *heb.* תָּלַשׁ, *ar.* شَلَّ, fut.

مَهْمَنْتُ extraxit, eduxit; *intrans.*

مَهْمَنْتُ, *ar.* سَلَّ and *heb.* תָּלַשׁ, quietit, siluit; tranquillus fuit,

cessavit a re, c. قُسْمٌ destitit; قُسْمٌ كَهْ دِلَسْ وَنُهْ كَهْ مُهْلَلْ melius est ut quis a loquendo desistat. *Part. act. præs.* حَكْ وَهْ حَمْ sedatus est tumultus. *Part. pass. p्रæt.* حَلْلَهْ , حَلْلَهْ pices extra-hens: ardea avis (gall. héron). *Part. pass. p्रæt.* حَلْلَهْ , حَلْلَهْ quietus. حَلْلَهْ vita tranquilla, seu vita contemplativa; gramm. حَكْكَهْ littera seu consonans quiescens; f. emph. et subst., حَكْكَهْ, heb. شَدِيهْ et ar. سَقَى, pl. حَلْلَتْ secundinæ seu membrana foetum involvens; it. quies.

Pa. حَكْ fecit ut quiesceret, silentium indixit; cohibuit, repressit; *ap. gramm.*, litteram quiescentem fecit, vocali eam destituit.

Ethpa. حَكْكَهْ ad quietem redactus est; it. eductus est.

Aph. حَكْكَهْ quiescere fecit, cessare fecit; it. eduxit. *Part. act.* حَمْ , emph. et subst. fuscina, furca, pl. حَمْكَهْ furca, cfr. neo-ar. مِشَى , magnum cochlear.

حَمْمَهْ cessatio, quies; حَلْلَهْ حَمْمَهْ indesinenter; it. caverna, spe-lunca.

in cavernis habitans. حَمْمَهْ quies, tranquillitas, silentium, otium; gramm. quiescentia seu parentia vocalis (ar. سَكُون). حَمْمَهْ وَكَلْلَهْ noctis silentio. حَمْمَهْ , حَمْمَهْ حَمْمَهْ et حَمْمَهْ subito, repente, statim; tacite; حَمْمَهْ لَسَهْ حَمْمَهْ subito.

حَمْمَهْ quies, pax. حَمْمَهْ حَمْمَهْ pacifice, pacate; sine strepitu. حَمْمَهْ حَمْمَهْ flere coepit silentio.

حَمْمَهْ cessans; it. scopa. حَمْحَهْ et حَمْحَهْ locus depresso inter duos montes, vallis, inde lucus.

حَمْحَهْ cauda, pars pinguis caudæ avium ut anas etc.

حَمْحَهْ tumores aquosæ: pus-tulæ oculum affidentes.

حَمْبَهْ f., pl. حَمْبَهْ , cfr. σκελετός, vel ass. schalamtu, sceletus, cadaver.

حَمْبَهْ et deriv., v. s. حَمْ .

حَمْبَهْ insufflavit magus in nodos. *Part. act.* حَمْكَهْ ; emph. et subst. حَمْدَهْ deser-tus locus; puteus profundus.

حَمْبَهْ insufflatio. حَمْدَهْ profunditas.

حَمْبَهْ , heb. حَلْشَ , fut. نَعْكَهْ

et مُكْنِكْ misit, *c.* « *vel* لَهْ ; dimisit, reliquit ; removit, exuit *vestem* ; *it.* *abs.* مُكْنِكْ *id.* ; *trop.* لَهْ لَهْ لَهْ لَهْ لَهْ non exui luctum de eo, *h. e.* adhuc defleo illum. *Part. pass.* لَهْ nudus ; *subst.* Apostolus ; litteræ apostolicae.

Ethpe. مُكْنَدْلِ pass.

Pa. مُكْنِكْ , *ar.* حَلَقَ , exuit, spoliavit ; liberavit *a re.* *Part. pass.* لَهْ nudus ; *subst.* cortex ; *f.* مُكْنَدْلَهْ وَ حَلَقَهْ casia.

Ethpa. مُكْنَدْلِ pass. et refl. ; بَلَقَهْ سَتَّهْ لَهْ se exuit vestibus suis.

Aph. مُكْنِكْ detraxit, exuit, nudavit, *c.* *dupl.* *acc.* pers. et rei ; *trop.* removit.

مُكْنِكْ exutio, spoliatio ; exuviae ; *it.* ripa fluvii.

مُكْنِكْ exuviae serpentis, *ar.* سَيَاجٌ .

مُكْنِكْ examen apum ; pellis.

مُكْنِكْ mittens, allegans.

مُكْنِكْ legatio, apostolatus ; collect. Apostoli ; *it.* nuditas ; exuviae ; *trop.* rerum abjectione, abnegatio ; *adverb.* مُكْنِكْ nude.

مُكْنِكْ apostolicus.

مُكْنِكْ nude.

مُكْنِكْ planta medicinalis.

لَهْ , heb. לְלַשׁ , ar. طَلْطَلْ , fut. مُكْنِكْ dominatus est, imperavit, *c.* « *vel* لَهْ pers., invasit, vi oppressit.

Pa. مُكْنِكْ dominationem, imperium detulit alicui ; præfecit, potestatem, jus dedit alicui in aliquem, *c.* لَهْ . *Part. pass.* مُكْنِكْهْ , مُكْنِكْهْ ; præfector, dominus. لَهْ حَلَقَهْ مُكْنِكْهْ liber, vir sui juris.

Ethpa. مُكْنَدْلِ pass. ; dominatus est, valuit. لَهْ لَهْ مُكْنَدْلَهْ urbem potitus est.

Aph. لَهْ مُكْنِكْ dominari fecit ; præfecit aliquem, *c.* « *vel* لَهْ ; seq. بَلَقَهْ دَامَهْ dedit ei potestatem, imperium.

مُكْنِكْ potestas, imperium, ditio ; dominatus ; auctoritas, licentia ; Dominatio, nomen classis Angelorum ; *it.* dominator, princeps, *ar.* سَلَطَانٌ .

لَهْ مُكْنِكْ dominium, potestas, imperium, potestas regia.

مُكْنِكْهْ , مُكْنِكْهْ potestatem habens, dominans ; dominator, rex, præfector ; *pl.* لَهْ مُكْنِكْهْ تَتَ ; *it.* licitum, res licita. لَهْ دَدَهْ مُكْنِكْهْ omnipotens Deus.

مُحْكَمٌ potestas, jurisdictio,
dominatio.

لَهْلَمْ, *heb.* לְהַלֵּם, *pharetra*;
jaculum, *cfr.* لَهْلَمْ *id.*

مَحْكَمَةٌ potestas, principatus, præfectura. **مَحْكَمَةٌ**, vel etiam *absol.*, potestas sui ipsius, liberum arbitrium.

מִקְרָא præda, cfr. *heb.* מִקְרָא
eduxit, extraxit; subripuit
et ar. مَكْرَأَ extraxit *et* أَسْعَى
rapuit; *it.* concatenatio, con-
junctio.

سَاقِصٌ saccus, cfr. ar. سَاقِصٌ sporta.
سَاقِصٌ, ar. سَاقِصٌ, pl. سَاقِصَاتٌ et
سَاقِصٌ crux fluens, guttae san-
guinis.

حَلْلٌ, *pl. حَلَّاتٌ*, *ar.* شَلِيلٌ, *vestis*
quæ sub lorica induitur, par-
va lorica.

fluens, defluens.

مَهْمَ, emph. **مَهْمَهْ** et **مَهْمَهْ**,
contr. a **مَهْمَهْ**, ap. gramm.
punctum, interpunctio; it. in
st. emph. ar. ȝ i. catena.

لِكَوْنَة et **لِكَوْنَة** concatenatus.

مَسْلَةً، مَهْتَلًا، pl. مَهْتَلَاتٍ، ar. مَهْتَلًا، obelus, subula.

مָדֵם, *heb.* מָדֵם, *ar.* مَدِيمٌ, *fut.* مَكْتُومٌ *integer, absolutus, perfectus fuit; impers.* مَدِيمٌ

completus est ; incolumis fuit
vel factus est ; exitum, finem
habuit, periit, mortuus est ;
defecit ; convenit, congruit,
similis fuit ; assensit, ac-
quievit, *c.* ﴿ مَعْلُومٌ ﴾ ; **وَمُكْبَرٌ مَحْدُوبٌ حَمْدَهُمْ دَافِعٌ**
Simon
Stylita qui nomine æque ac
opere Simoni Cephæ similis
est. *Part. præs.* مَدْعُونٌ ، مَدْعُونَةٌ .
Part. præt. مَكْبُرٌ : sapus.

Ethpe. ~~αὐτοῦ~~ deditus est,
traditus est: se tradidit.

Pa. مُكْتَمِلٌ *absolvit*, perfecit,
explevit : persolvit *votum* ;
salutavit aliquem, e. *وَلَمْ يَمْرُدْ* ;
 مُكْتَمِلٌ *vitam finivit*,
exspiravit. كَمْ لَمْ يَكُنْ مُكْتَمِلٌ
 كَمْ يَكُونَ مُكْتَمِلٌ *permitte mihi ut
 valedicam parentibus meis.*
Part. pass. مُكْتَمِلٌ ;
perfectus, completus.

Ethpa. **خَلَّا** pass.

Aph. أَمْكَحْ, *ar.* أَنْتَ, dedit,
tradidit; prodidit; commisit,
commendavit; concessit, per-
misit, *cum* & *pers.*, *et c.*, *et*
fut.; obsecutus est, *c.* & *trop.*
scripto tradidit, docuit: *it.*,
ar. أَنْتَ, religionem Mahu-
medis professus est. **أَمْكَحْ**
أَمْكَحْ دَتْهَةٍ filias matrimonio collo-
cavit. **أَمْكَحْ تَفْعِلْ** tradidit

spiritum. « مُدْعَى نَفْعِهِ dedit
operam rei. مُدْعَى كَوْنِيَا
obsecutus est, assensit. مُدْعَى
تَرْجُونِيَا terga vertit, fugit. Part.
pass. مُدْعَى ، مُدْعَى ; subst.
مُدْعَى ، ap. Orient. مُدْعَى ،
finis anni.

Ettaph. مُدْعَى traditus est ;
it. accepit, ar. تَسْلَمَ .

مُكْرَمٌ ، مُكْرَمٌ salus, incolumi-
tas, pax ; مُكْرَمٌ pax vo-
bis, salvete. مُكْرَمٌ saluta-
tum venit aliquem. مُكْرَمٌ salutavit ; مُكْرَمٌ et
vel مُكْرَمٌ id. مُكْرَمٌ rediit incolumis.
مُكْرَمٌ , f. مُكْرَمٌ integer,
perfectus, sanus.

مُكْرَمٌ , f. مُكْرَمٌ perfectus,
integer ; مُكْرَمٌ holocau-
sta ; gramm., sanum se re-
gulare plurale, ar. الجَمْعُ السَّالِمُ .
مُكْرَمٌ integritas, perfectio ;
concordia, consensus, conve-
nientia, assensus, suffragium ;
ap. gramm., al. مُكْرَمٌ , con-
gruentia (gall. accord).
مُكْرَمٌ , pl. مُكْرَمٌ ,
cóncors, socius.

مُكْرَمٌ perfectio, con-
summatio ; meta, finis. حَمَّةٌ
مُكْرَمٌ مُكْرَمٌ intra metam
subsistens : fines non præter-

grediens. حَمَّةٌ in finem, in
perpetuum.

مُكْرَمٌ integer.

مُكْرَمٌ integer, perfectus, ab-
solutus. مُكْرَمٌ vita per-
fecta, seu beatitudo æter-
na.

مُكْرَمٌ , p!. مُكْرَمٌ or-
namenta, gemmæ, carbasa.

مُكْرَمٌ perfecte.

مُكْرَمٌ tradens, proditor ; it.
Moslemus.

مُكْرَمٌ traditio ; doctrina ;
nomen accentus.

مُكْرَمٌ مُكْرَمٌ obsequens.
مُكْرَمٌ proditio, perfidia.

شَيْلَمْ , مُكْرَمٌ , ar. شَيْلَمْ ,
شَارِبٌ , شَوَّلِمْ , zizania, lolium.

مُكْرَمٌ et مُكْرَمٌ fissuræ, al. la-
pides prominentes.

مُكْرَمٌ , fut. مُكْرَمٌ aruit,
marcuit, languit ; trans., مُكْرَمٌ ,
fut. مُكْرَمٌ extraxit, evulsit.
Part. præs. act. مُكْرَمٌ ;
vulsella. Part. pass. مُكْرَمٌ
evulsus; it. subst. sac-
cus frumentarius, ar. سَنْتَ .
Ethpe. مُكْرَمٌ evulsus, educ-
tus est.

Aph. مُكْرَمٌ arcfecit, marces-
cere fecit.

مُكْرَمٌ et مُكْرَمٌ culter.

مَعْدُلٌ adeps phasiani avis etc.

مَعْدُلٌ vulnus.

مَعْدُلٌ, pl. **مَعْدُلَاتٌ** olla; vesica bullæ; tumor.

مَعْدُلٌ tumor.

مَعْدِلٌ, ar. ساق, fut. مَعْدُلٌ elixavit carnem, coxit, fervefecit. Part. pass. مَعْدُلٌ elixus, coctus, assa caro.

Ethpe. مَعْدُلٌ pass.

مَعْدِلٌ elixatio, coctio; succus carnium, omphacii succus.

مَعْدُلٌ variola morbus.

مَعْدُلٌ olus, ar. ساق beta.

مَعْدُلٌ mustela.

مَعْدِلٌ, vide مَعْدِلٌ.

مَعْدِلٌ, heb. מְעַדֵּל, ar. مَعْدِلٌ, pl. مَعْدِلَاتٌ et مَعْدِلَاتٍ, c. suff. مَعْدِلٌ, f. مَعْدِلٌ, f. مَعْدِلٌ; pl. مَعْدِلٌ, مَعْدِلٌ, مَعْدِلٌ, مَعْدِلٌ, مَعْدِلٌ, nomen, verbum, vox, vocabulum, titulus libri; trop. existimatio, fama; spec. in pl. emph. f., prætextus, species, causa; apud gramm., signum; nomen; subjectum.

مَعْدِلٌ فُتُوهٌ puncta vocalia. **مَعْدِلٌ** وَقْدَسَاتٌ interpunktio- nis signa. **مَعْدِلٌ** هَذِهِمْ et **مَعْدِلٌ** nomen proprium. **مَعْدِلٌ**

مَعْدِلٌ et **مَعْدِلٌ** نَعْدِلٌ nomen commune.

مَعْدِلٌ nomen concretum.

مَعْدِلٌ هَذِهِمْ nomen abstractum.

مَعْدِلٌ infamia; adv. حَمْفُدِلٌ nominatim; ea causa.

مَعْدِلٌ دَنْ مَعْدِلٌ eodem nomine appellatus.

مَعْدِلٌ اَلْمَوْتَى وَمَعْدِلٌ اَلْمَوْتَى vel اَلْمَوْتَى وَمَعْدِلٌ اَلْمَوْتَى vir celebris.

مَعْدِلٌ وَمَعْدِلٌ اَلْمَوْتَى verba laudis: præconia.

مَعْدِلٌ اَلْمَوْتَى وَمَعْدِلٌ اَلْمَوْتَى nummos suo nomine proculdit.

مَعْدِلٌ مَعْدِلٌ اَلْمَوْتَى qua de causa, propterea, itaque.

Pa. مَعْدِلٌ et اَلْمَوْتَى v. denom., nominavit, cognominavit, designavit, nomen attribuit.

اَلْمَوْتَى مَعْدِلٌ de se prædicabant. Part. pass.

اَلْمَوْتَى مَعْدِلٌ, f. اَلْمَوْتَى; celebris.

Ethpa. مَعْدِلٌ et اَلْمَوْتَى nominatus est, appellatus est; nomen, famam nactus est, celebris fuit.

اَلْمَوْتَى مَعْدِلٌ nominalis.

اَلْمَوْتَى مَعْدِلٌ nominatio, appellatio; fama; apud gramm., adjectivum (ar. صَفَة, gall. qualificatif).

اَلْمَوْتَى مَعْدِلٌ nominatim, distinete.

اَلْمَوْتَى مَعْدِلٌ nominatio; fama.

اَلْمَوْتَى مَعْدِلٌ ap. gramm., substan-

tivum nomen (ar. المَوْضُوف, gall. le qualifié).

عَدْتَ, c. gener. et num., c. suff. حَفَّ, حَفَّمْ, st. abs. حَدَّتْ, cœlum, coeli; pars superior rei, tectum, *cfr. heb.* زَيْرٌ et ar. سَمَّ a v. سَمَّ altus fuit, eminuit, conspicuus fuit. **عَدْتَ مَهْتَ** Cœli Cœlorum. **عَدْتَ سَحْنَ** palatum. **عَدْنَةً** fornices. **عَدْنَمْ**, حَدَّمْ, f. emph. حَدَّمَمْ, pl. f. حَدَّمَمْ, cœlestis. **عَدْنَتْ**, حَدَّنَتْ, f. emph. حَدَّنَتْ, pl. حَدَّنَتْ id.

عَذَبَ, - Pa. حَذَبْ neglexit, contempsit; rejicit, maledixit; *intrans.*, delicate vixit. Part. pass. حَمْدَبْ delicatus; piger, negligens, socors. **عَذَبَتْ** mollis et delicata vita, mollities; maledictio.

عَذَلَ extraxit, eduxit; evaginavit *gladium*; evulsit, eradicavit, deglabravit; discalecavit. Part. act. حَذَلْ; subst. securis. Part. pass. حَذَلْ; discaleceatus. **عَذَلَتْ خَارِجَةً** mente captus, amens. **عَذَلَتْ** districtus ensis.

Ethpe. حَذَلَنْ pass.

Ethpa. حَذَلَنْ pass.; حَذَلَنْ on sœvit *taurus, equus*.

Aph. حَذَلَنْ eduxit; حَذَلَنْ مَحْفَأَةً discalecavit eum.

عَذَلَنْ evaginatio, evulsio.

عَدَنْ مَهْتَ securis; glomus gossippii dissecti.

عَدَنْ مَهْتَ excoriatio.

عَدَنْ مَهْتَ et حَذَلَنْ حَذَلَنْ ut حَذَلَنْ.

عَدَنْ مَهْتَ nudis pedibus.

عَدَنْ مَهْتَ evulsio.

عَدَنْ مَهْتَ mola, pistrina.

عَدَنْ مَهْتَ cepe; foetor axillarum.

عَدَنْ مَهْتَ et deriv., v. s. حَذَلْ .

عَذَنْ, ar. سَوْنَ, fut. حَذَنْ pinguis fuit; maturus fuit *fructus*.

Pa. حَذَنْ pinguefecit, saginavit; maturavit *fructum*.

Aph. حَذَنْ id.

عَذَنْ مَهْنَتْ pinguedo, adeps; butyrum, ar. سَمَن; trop. fertilitas *terreæ*.

عَذَنْ مَهْنَتْ pinguis; fertilis.

عَذَنْ مَهْنَتْ obolus, quadrans.

عَذَنْ, ar. سَوْنَ, fut. حَذَنْ, imp. حَذَنْ, c. suff. حَذَنَنْ, pl. حَذَنَنْ et حَذَنَنْ, audivit, percepit, intellexit, c. acc., و vel حَذَنْ rei; percun-

etatus est, quæsivit ; auscultavit, exaudivit ; obedivit, obsecutus est. **عَدْنَهُمْ كُلُّهُمْ** audite hæc verba mea. *Part. pass.* **عَصِيَّا** ; *subst. dux*, princeps ; *impers.* **عَصَمَكَ** audi-
divi.

Ethpe. **عَدَمْلُ** *pass.* ; *it. c.* **عَدْنَهُمْ**, obedivit, *ar.* إِسْتَمَمْ ; *impers.* **عَدَمَهُمْ كُلُّهُمْ** audivi, mihi compertum est. **عَصْفَا** **لَوْلَى** **عَدَمَهُمْ كُلُّهُمْ** sicut auditum fuerat. *Part. pres.* **عَدَمَهُمْ** obediens.

Aph. **عَدَمْ** audire fecit, *c. acc.* *pers.* et *rei* ; edocuit, certiorrem fecit, *c. rei*. *Part. pres.* **عَدَمْ**, **عَصِيَّا** ; *subst. v. infra*.

عَدْنَهُمْ auditus ; rumor, fama ; *it.* cantus, cantilena.

عَدَمَهُمْ *id.* ; obedientia.

عَدْنَهُمْ auditio ; nuntius spec. infiustus, *pl.* **عَدَمَهُمْ** et **عَدَمَهُمْ**.

عَدَمَهُمْ auditor ; discipulus.

عَدَمَهُمْ **عَدَمَهُمْ** auditio, auditus.

عَدَمَهُمْ كُلُّهُمْ auscultatio ; auditus.

عَدَمَهُمْ, *pl.* **عَدَمَهُمْ** sensus auditus, aures ; auditio, auditus, auscultatio.

عَدَمَهُمْ audire faciens.

عَدَمَهُمْ is cui obeditur ; *it.* obediens.

عَدَمَهُمْ obedienter.

عَدَمَهُمْ auditus, obedientia, obsequium ; *præc.* **عَدَمْ**, inobedientia.

عَدَمَهُمْ ars ceram conficiendi ; inceratio ; *cfr. ar.* **عَدَمْ** cera.

عَدَمَهُمْ *Pa.* **عَدَمَهُمْ** emisit, injecit, immisit ; dimisit, abegit ; *trop. e severitate remisit.* **عَدَمَهُمْ** lacrymas effudit. **عَدَمَهُمْ** vocem emisit. **عَدَمَهُمْ** mentem applicavit, *c. rei*.

Ethpa. **عَدَمَهُمْ** *pass.* ; *it.* defluit, se immisit.

عَدَمَهُمْ emissio, immissio ; dimissio.

عَدَمَهُمْ *vel* **عَدَمَهُمْ** feniculum capillaceum planta.

عَدَمَهُمْ dimissio, effusio.

عَدَمَهُمْ, *heb.* שָׁדָר, adamas ; *it.* σμύρις, terra ad polendum adhibita.

عَدَمَهُمْ abundanter effusus.

عَدَمَهُمْ, *c. seq.* **عَدَمَهُمْ**, *al.* **عَدَمَهُمْ**, **عَدَمَهُمْ**, isatis tinctoria.

عَدَمَهُمْ camelii species, *cfr. ar.*

عَدَمَهُمْ camelus velox.

عَدَمَهُمْ fumus.

عَدَمَهُمْ emittens, dimittens.

عَدَمَهُمْ dimissus.

دِمِسْجَى مُهْمَّةً نَهَا dimissio, effusio.
نَهَّى مُهْمَّةً , f. نَهَّى مُهْمَّةً nyctalops.
نَهَّى مُهْمَّةً نَهَّى نَهَّى nyctalopis vitium.

مَعْلُومٌ — *Pa.* مُهْمَّةً ministra-
vit, famulatus est, *Deo* servi-
vit, *c.* & *vel acc.* *pers.*; co-
luit, liturgico officio functus
est; egit, gessit, perfecit
rem.

Ethpa. مُهْمَّةً *pass.*; admi-
nistratus est, tractatus est;
evenit, contigit: *c.* ت, re
aliqua occupatus fuit. مُهْمَّةً
مَنْتَهَا gestum est bellum.
مُهْمَّةً مَنْتَهَا لَمْحَى rei
mentio inter eos incidit; *it. v.*
infra s. مُهْمَّةً .

مُهْمَّةً , *unde ar.* شَمَاسٍ, famulus,
minister; diaconus, *f.* مُهْمَّةً
diaconissa.

مُهْمَّةً famulatus, ministe-
rium, diaconatus.

مُهْمَّةً minister, administrator;
legis observator; diaconus, *f.*
مُهْمَّةً ministra, famula;
diaconissa, *pl.* مُهْمَّةً .

مُهْمَّةً مُهْمَّةً servitium, famulatus,
diaconatus.

مُهْمَّةً is cui famulatur; domi-
nus, herus.

مُهْمَّةً , *pl.* مُهْمَّةً minist-
rium, famulatus; munus,

officium; opus, Officium li-
turgicum; حَنْتَهُ مُهْمَّةً , *pl.*
حَنْتَهُ مُهْمَّةً famulus, minis-
ter. حَنْتَهُ مُهْمَّةً officia
Vigiliarum.

مَهْمَّةً , مُهْمَّةً , *ar.* شَمْسٍ, pler. m.
sol; *ap. Alchem.*, aurum.

Ethpa. مُهْمَّةً *v. denom.*, soli
expositus est, ad solem se ex-
posuit.

مُهْمَّةً مُهْمَّةً solaris; cultor solis; *f.*

مُهْمَّةً مُهْمَّةً ; subst. eclipsis solis.

مُهْمَّةً مُهْمَّةً coram sole, sole clarus.

مُهْمَّةً مُهْمَّةً tectona grandis arbor.

مَهْمَّةً , fut. حَنْتَهُ movit se,
discessit, desiit, destitit *a re*
c. مُهْمَّةً ; mutatus est; *it. et im-*
pers. حَنْتَهُ مُهْمَّةً insanivit. Part.
præs. حَنْتَهُ , حَنْتَهُ ; desipiens,
stultus, *pl. emph.* حَنْتَهُ .
Part. præt. حَنْتَهُ ; stultus.

Ethpe. حَنْتَهُ desipuit.

Pa. حَنْتَهُ movit, mutavit, trans-
tulit; migrare fecit, removit,
abstulit; *cfr.* حَنْتَهُ immuta-
vit; حَنْتَهُ حَنْتَهُ saporem mu-
tavit: desipuit; *intrans.*, mi-
gravit, discessit, recessit;
trop. obiit; حَنْتَهُ حَنْتَهُ a
recto declinavit; *c.* & *explet.*,
حَنْتَهُ حَنْتَهُ secesserunt. Part.

act. مِهْمَلٌ, مِهْمَلٌ; مِهْمَلٌ
migramus.

Ethpa. וְהִלֵּל pass.; resipuit;
cfr. וְהַלֵּל mutatus est.

Aph. ~~هَلْكَ~~ insanum reddidit,
avertit; *it. intr.*, insanus fuit.

لـ insania.

Lata et *Lata* id.

حُمْرٌ stultus ; *it.* stultitia.
حَمْرَةٌ, **حَمْرَّةٌ** mutatio, transla-
 tio, migratio, discessus ; obi-
 tus, mors ; gramm. activitas
seu qualitas verbi transitivi ;
it. al. sensu, v. s. **حَمْرَةٌ**.

مُمْلِكَةً *adverb.*; c. **يُ**, immobi-
liter.

مُتَحْمِلٌ transferens; ap. gramm.,
transitivum verbum.

هـ , emph. هـ , ar. سـة , st. c.
 هـ , pl. هـ , s. est. هـ ,
 emph. هـ et nng. هـ , e.
 suff. هـ , هـ etc.,
 annus ; دـتـ هـ coævi
 mei ; adverb. هـ per annos.

دَلَّا هُنَّا vel دَلَّا هُنَّا quotan-
nis ; دَلَّا هُنَّا حَمْنَى id.

جِهَنَّمَ quotannis.
جِهَنَّمَ annuus.
جِهَنَّمَ revolutio annualis

اعْلَم, fut. **اعْلَمْتُ** amavit,
deperdite amavit; ægrotum,
infirmum reddidit amor; su-

peravit, vicit, fugavit; *cfr.* منق. *Part. pass.* منق; infirmus.

Pa. ~~¶~~ cruciavit eum amor;
vicit.

Ethpa. *καὶ* pass.

Ἵμη, emph. **Ὕμης** amor; in st.
emph. voluptas, illecebræ.

~~La~~ amor ardens.

جـ-١٢ - *Pa.* مُتَبْ torsit, cruciatus affectit, c. ۵ pers.

Ethpa. **ئەڭ** pass.; *it.* crucia-
vit, c. ١.

أَعْنَبٌ, pl. أَعْنَبٌ cruciatus, supplicium, tormentum.

عَذَابٌ, pl. **عَذَابٌ**, it. **عَذَابٌ** cru-
ciatus, supplicium.

λίμνη γελάνδιον, navis magna
(gall. chaland).

سُمْدَة incantatio Magorum.

لَهُ, fut. نَعْتَ et declin-
navit, deviavit, recessit ;
trop. obiit ; it. trans., muta-
vit. مَنْ كُحْبَرْ timore pereul-
sum est cor ejus.

Pa. ~~in~~ recessit.

Aph. ~~si~~ declinare fecit, dis-
traxit.

مُنْهَاجٌ devia-

هُنَّهُنًا, f. **هُنَّهُنَّا** irregularis;
subst. auriga.

مَعْكُرٌ devians; remotus.

مَعْنَى f., ar. مَعْنَى , pl. مَعْنَى

dens; ebur; trop. cacumen montis, scopulus; aculeus ferreus, cuspis, ut مَعْنَى , pl. مَعْنَى وَمَعْنَى ; مَعْنَى furunculi. مَعْنَى سَمَّا مَعْنَى feræ voraces. مَعْنَى وَأَحَدًا eryngium planta.

مَعْنَى , ar. سَيَانَ muero, cuspis hastæ etc.; spica; trop. in f. emph. مَعْنَى dens ferri, serræ etc., dentale; prominentia, rupes; collis, pl. مَعْنَى .

مَعْنَى acutus.

مَعْنَى , ar. مَسَنَ , cos.

مَعْنَى - Pa. مَعْنَى anxit, tortit, cruciatu affecit, vexavit, oppressit; cfr. ar. شَقَ stranguavit.

Ethpa. مَعْنَى pass.

مَعْنَى cruciatus.

مَعْنَى angor, cruciatus, tormentum.

مَعْنَى cruciatus; suppli- cium.

مَعْنَى ; it. مَعْنَى , ar. مَعْنَى ; it. مَعْنَى , ar. سَوْرَ felis, cfr. مَعْنَى .

مَعْنَى , v. s. مَعْنَى .

مَعْنَى , ar. أَشْتَهَ , mucor albus arborum.

مَعْنَى , v. s. مَعْنَى .

لَعْنَى , fut. لَعْنَى lusit, jocatus est.

Ethpe. مَعْنَى usitat. q. Pe., lusit. حَمْدَى حَمْدَى praeceps in saltatione ruit (gr. κυβεστάω).

Ethpa. مَعْنَى enarravit, sermone explicuit; it. ut Ethpe.

Ettaph. مَعْنَى illusus est.

مَعْنَى et مَعْنَى lusus, jocus; ludibrium. حَمْدَى وَمَعْنَى ludi verborum: ludi scenici. حَمْدَى وَمَعْنَى ludi canticorum: dramata musica.

مَعْنَى id.

مَعْنَى stultitia.

مَعْنَى , c. suff. مَعْنَى , pl. مَعْنَى مَعْنَى sermo, narratio, fabula.

مَعْنَى jocus; colloquium.

مَعْنَى lusus.

مَعْنَى id.

مَعْنَى , pl. مَعْنَى sermo; narratio, historia; gramm., prædicatum (*id. q. ar. بَجَر*, gall. attribut); it. modus indicativus, ut مَعْنَى .

مَعْنَى narrativus.

مَعْنَى lusus.

حَمْدَى سَفَوَةٌ ; مَعْنَى

vestes cerei coloris.

مَعْنَى et مَعْنَى cereus, ceræ colori similis.

مَدَّا, v. s. مَدَّ.

مَدَّلُ, ar. شَعْبَان, mensis octau-
vus anni lunaris ap. Mosle-
mos.

مَدَّجُ c. deriv., v. s. حَمْرَ.

مَدَّوُنٌ canis aureus (gall. cha-
cal).

مَدَّلُ, fut. تَمَدَّلَ natavit;
مَدَّهُ خَلَّ volavit.

Pa. تَمَدَّلَ natavit.

مَدَّهَا natatio; volatus.

مَدَّهَا natans, natator, nata-
tilis.

مَدَّهَا foetus, spec. genimen
serpentis.

مَدَّلُ, fut. تَمَدَّلُ, ar. سَعَل, tussivit.

مَدَّهُ لُ et مَدَّهُ لُ tussis.

مَدَّهُ لُ tussiens.

مَدَّهُ لُ pugillus, manipulus.

مَدَّكُ c. deriv., v. s. حَلَّ.

مَدَّكُ et مَدَّهُ لُ eibi genus.

مَدَّهُ لُ limus, lutum.

مَدَّهُ لُ limus.

مَدَّهُ لُ luteus, limosus.

مَدَّهُ لُ terrea substantia.

مَدَّلُ, fut. تَمَدَّلُ, ut usit. Pa.;
cfr. مَدَّ.

Pa. مَدَّلُ illevit, lævigavit;
expolivit.

Ethpa. مَدَّهُ لُ pass.

Palp. مَدَّهُ لُ ut Pa.

Ethpalp. مَدَّهُ لُ pass.

Aph. مَدَّهُ لُ polivit.

مَدَّهَا, مَدَّهُ لُ lævis, glaber;
subst. petra glabra, lævis;
pumex; pl. مَدَّهَا calculi.

مَدَّهَا laevitas, glabrities;
lævor. مَدَّهَا بِرْهَةً colli nu-
dæ partes.

مَدَّهَا, f. مَدَّهَا lævis, lenis; val-
de tenuis et translucida nubes.

مَدَّهَا initio, litura, expolitio;
laevitas; mollities. مَدَّهَا

مَدَّهَا dysenteria.

مَدَّهَا radula; trulla.

مَدَّهَا radix.

مَفَّهُلُ et مَفَّهُلُ, fut. تَمَفَّهُلُ clausus, purus factus est; con-
gruit; trans. lævigavit, lima-
vit, purificavit. Part. مَفَّهُلُ,
مَفَّهُلًا. Part. præt. pass. مَفَّهُلُ,
مَفَّهُلًا; purus, mundus;
subst. planities; juseulum;
f. emph. مَفَّهُلُ limatura,
scobs; it. metrum mensura.

Pa. مَفَّهُلُ complanavit, expla-
navit; purificavit, liquavit,
percolavit. Part. act. مَفَّهُلُ,
مَفَّهُلًا; nitens.

Ethpa. مَفَّهُلُ pass.

مَفَّهُلُ lævigatio, dolatio, lima-

tio; trop. aculeus, stimulus;
offendiculum.

﴿۷۰﴾ limator, dolator, politor.

﴿۷۱﴾ puritas, sinceritas;
nitor, venustas.

﴿۷۲﴾ pure, sincere;clare.

﴿۷۳﴾ adeps suillæ, arvina
(gall. saindoux).

﴿۷۴﴾ acus grossior.

﴿۷۵﴾ , fut. نَفَقَهُ transfixit,
confodit; permeavit.

Pa. نَفَقَهُ , ar. نَسَّ , infixit;
transfixit, confodit.

Ethpa. نَفَقَهُ pass.

﴿۷۶﴾ infundibulum molæ.

﴿۷۷﴾ veru ferreum quo trans-
fixæ carnes assantur; it. ru-
tabulum furni, cfr. ar. سَقُودْ ,
id.

﴿۷۸﴾ et أَمْعَادٌ , pers. شَنِينْ , hos-
pitium; cella monachi.

﴿۷۹﴾ , heb. שְׁמַרְתָּ , liber Judi-
cum.

﴿۸۰﴾ , heb. טַעַשׂ , ar. سَكَنْ ,
fut. نَعْقَمَهُ infudit, effudit.
Part. act. مَعْتَدٌ ; subst. in-
fundibulum; مَعْتَدٌ clyster; aquæductus.

Ethpe. أَمْعَادٌ pass.

﴿۸۱﴾ clyster.

﴿۸۲﴾ effusio.

﴿۷۵﴾ مَعْقَدٌ clyster.

﴿۷۶﴾ et مَفَّقَهُ , heb. נַעֲשֵׂה ,
ar. سَقَلْ , fut. نَفَقَهُ depres-
sus, humiliis factus est; in-
firmus, vilis fuit.

Pa. مَفَّقَهُ depressit, dejecit,
prostravit, humiliavit,
Ethpa. نَفَقَهُ pass.; laboravit,
debilitatus est.

Aph. نَفَقَهُ fatigavit; it. fati-
gatus, defessus fuit; torpuit,
segnis fuit, defecit a re, c.
لَمَّا vel مَوْهَى .

﴿۷۷﴾ مَعْلَمٌ humiliatio; it. spec. in pl.
مَعْلَمٌ fimbria.

﴿۷۸﴾ مَعْلَمٌ declivitas, clivus.

﴿۷۹﴾ مَعْلَمٌ humilitas.

﴿۸۰﴾ مَعْلَمٌ , مَعْلَمَاتٌ , pl. لِمَةٌ imum,
extremitas rei; radix, pes
montis; limes, margo; fimb-
ria.

﴿۸۱﴾ مَعْلَمٌ , st. est. مَقَدَّمٌ , ap. Occid.

﴿۸۲﴾ , f. مَعْلَمَاتٌ , pl. مَعْلَمَاتٌ depressus, humiliis, humilia-
tus; asceta; infirmus, piger;
pusillanimis; مَعْلَمٌ igna-
vus.

﴿۸۳﴾ مَعْكَرٌ humilitas, vilitas,
imbecillitas; dejectio a pris-
tino statu, otium.

﴿۸۴﴾ مَعْكَرٌ ellychnium; quercus;
ap. medicos, suppositorium.

عَمَّعَكُمْ infirmitas.

عَفَ , fut. عَفَ occavit, complanavit terram.

Pa. عَفَ id.

عَمَّعَ runco, rastra.

عَفَ , fut. عَفَ exundavit, effudit se. Part. præt. عَفَ ; largus, copiosus, liberalis. عَفَةٌ عَفَةٌ عَفَةٌ عَفَةٌ عَفَةٌ pretiosa munera.

Pa. عَفَ effudit; exundavit. Part. pass. عَمَّعَ ; copiosus.

Ethpa. عَدَمٌ pass.; exundavit. عَدَمٌ عَدَمٌ عَدَمٌ عَدَمٌ sicuti aqua se extenderunt rugitus mei.

Aph. عَفَ effudit, profudit bona, c. عَ pers.

عَفَةٌ , pl. عَفَةٌ exundatio, inundatio, effusio; fluctus; affluentia, copia.

عَمَّعَ effusio.

عَمَّعَةٌ effusio, exundatio. عَلِيٌّ عَمَّعَةٌ عَمَّعَةٌ عَمَّعَةٌ sine sanguinis effusione non fit remissio.

عَمَّعَةٌ abundanter, copiose.

عَمَّعَةٌ abundantia, redundantia; copia, liberalitas. عَمَّعَةٌ عَمَّعَةٌ abunde.

عَمَّعَةٌ id.

عَفَ , fut. نَفَ rasit, contrivit; depressit alas avis terram stringens, cfr. عَدَمٌ et ar. سَنَ ; it. intrans., repsit, sensim reptavit, cfr. عَفَ .

Pa. عَفَ repsit.

Aph. آنَفَ complanavit, depressit; trop. induxit ad rem; depressit animam suam, seu morem gessit alicui; indulxit, permisit, concessit, obsecutus est; benigne egit, c. عَ .

عَفَةٌ лævigation.

عَفَهٌ reptans, reptile.

عَفَهٌ عَفَهٌ عَفَهٌ عَفَهٌ vitis palmites extendens. وَقَبَّسٌ عَفَهٌ laureola planta.

عَفَهٌ عَفَهٌ عَفَهٌ عَفَهٌ reptatio.

عَفَهٌ sarcophagus.

عَفَهٌ , pl. عَفَهٌ solea.

عَفَهٌ عَفَهٌ عَفَهٌ عَفَهٌ obsequium; benignitas.

عَفَهٌ , heb. שְׁמַרְתָּ , ar. سَفَرَ , splenduit lux, fut. نَفَ pulcher, formosus, decorus fuit; placuit; placere studuit, blanditus est; impers. عَفَهٌ عَفَهٌ mihi placuit ut. Part. præs. act. عَفَهٌ عَفَهٌ عَفَهٌ عَفَهٌ si placet. عَفَهٌ عَفَهٌ عَفَهٌ عَفَهٌ multum blandiens, placere studens.

Ethpa. مُفَدِّل placere studuit ; blanditus est.

Aph. مُفَدِّل pulchrum, formosum, decorum reddidit, ornavit, exornavit; auxit; *it.* placuit. مُفَدِّل pulchritudo, venustas; decor, splendor, gloria, virtus; *in pl.* مُفَدِّل bona.

مُفَدِّل pulcher, decorus, venustus; vanus; adulatorius.

مُفَدِّل adulatorie.

مُفَدِّل pulchritudo, venustas; adulatio.

مُفَدِّل blanditiæ.

مُفَدِّل pulchritudo.

مُفَدِّل adulator, adulatorius.

مُفَدِّل adulatio; complacentia in re, satisfactio, approbatio.

مُفَدِّل , ar. سَفَر , aurora, diluculum, mane. مُفَدِّل summo mane.

مُفَدِّل , f. *emph.* مُفَدِّل pulcher, elegans, formosus, venustus; carus, gratus; honestus, مُفَدِّل vel مُفَدِّل

مُفَدِّل pulchra aspectu;

مُفَدِّل spinacia plantu (*gall.* épinard).

مُفَدِّل granum foeni graeci; subst.

pulchrum, honestum (*gall.*

le beau, l'honnête); *it.* مُفَدِّل peritonæum; *pl. f.* مُفَدِّل

bona, beneficia; *adv.* مُفَدِّل recte, pulchre; مُفَدِّل male eum exceptit. مُفَدِّل tam دَكْتَهْ رَأَيْهْ ... كَحْتَهْ ... filios suos tam probe educavit ut... آمَدْنَهْ مُفَدِّل، مُفَدِّل، آمَدْنَهْ كَحْمَحَهْ quae feliciter accidunt proximo; *it.* reddit nomina græca quo^o *adv.* εὖ incipiunt: مُفَدِّل εὐπάθης, prospere vivens. مُفَدِّل εὐσεβεῖς, viri pii. مُفَدِّل εὐζωῖς, vita beata.

مُفَدِّل bene, pulchre.

مُفَدِّل مُفَدِّل pulchritudo, bonitas, splendor; probitas; *it nomina græca reddit, ut* مُفَدِّل εὐτεκνία; مُفَدِّل prolis prosperitas. مُفَدِّل εὐσεβία, pietas. مُفَدِّل مُفَدِّل εὐχρηστία, concinnitas. مُفَدِّل εὐδοξία, beneplacitum. مُفَدِّل εὐδοξία, felix vitæ cursus.

مُفَدِّل et مُفَدِّل مُفَدِّل sartor.

مُفَدِّل, heb. שׁוֹפָר, tuba.

مُفَدِّل adulator.

مُفَدِّل crus, v. s. مُفَدِّل .

مُفَدِّل inus., præter part. subst. usurp. q. v. *infra*; cfr.

heb. חַשֵּׁשׁ, *ar.* سَقْىٌ, irrigavit, potum præbuit.

Ethpe. اَعْدَفٌ irrigatus est.

Aph. اَعْمَكٌ bibendum dedit, potum dedit, *c. acc. pers. et rei vel c.» pers.*; وَمُبْشِّرٌ mihi *Domine* sanguinem tuum vitalem propinasti.

Ettaph. اَتَّمَّكٌ ad bibendum datus est; irrigatus est.

مَهْنَمٌ potus, potio; irrigatio; fluentum. خَمْدَةٌ terra rigata.

مَهْنَدٌ propotion; antidotum.

مَهْنَمٌ, pl. مَهْنَمَاتٍ potio, potatio, potus.

مَهْنَمَةٌ, pl. مَهْنَمَاتٍ et مَهْنَمٌ, مَهْنَمٌ pocillator; pincerna. وَهَنْدٌ مَهْنَمٌ magister pincernarum; *f. emph.* مَهْنَدٌ; *subst.* rivus vel canalis irrigatorius, *pl.* مَهْنَمٌ, *ar.* ساقية.

مَهْنَمٌ convivium, potationes.

مَهْنَمٌ, pl. مَهْنَمَاتٍ funiculus mensorius.

مَهْنَمٌ sistra, musicæ instrumentum.

مَهْنَمٌ, *id. q. لِهْنَمٌ*, amygdala.

مَهْنَمٌ perturbatio.

مَهْنَمٌ, fut. مَهْنَمٌ tulit, sustulit; assumpsit, cepit, abstulit; expugnavit urbem,

c. مَهْنَمٌ; commovit; accepit, suscepit, obtinuit; sustinuit, toleravit. مَهْنَمٌ طَافٌ sumpsit partes alicujus, favit ei. مَهْنَمٌ يَهْدِي حَمْنَمًا duxit uxorem. مَهْنَمٌ مَهْنَمَاتٍ victoriam reportavit. مَهْنَمٌ سَارِفٌ impetum cepit: eni-sus est, properavit, ad rem se aëcinxit. مَهْنَمٌ سَلَلٌ vires, animum sumpsit, audax factus est. مَهْنَمٌ كَحْنَمٌ curam suscepit, operam dedit, *c.* مَهْنَمٌ مَهْنَمَاتٍ وَتَبَرُّو وَهَنْدٌ invicem consuluiimus de *re facienda*, statuimus quod. مَهْنَمٌ مَهْنَمٌ fidem accepit *de sua vita seu incolumentate*, pac-tum iniit; مَهْنَمٌ prolixus fuit sermo. مَهْنَمٌ خَدَمًا occasio-nem arripuit. مَهْنَمٌ قَنْمٌ carnem assumpsit *seu incarnatus est Dei Filius*. مَهْنَمٌ finem sumpsit; completus est. مَهْنَمٌ حَمْنَمٌ rependit pecuniam; *intrans.*, se contulit, migravit: abiit; na-vem solvit; مَهْنَمٌ وَهَنْدٌ وَهَنْدٌ cum in eo essem ut abirem; مَهْنَمٌ كَهْنَمٌ abiit, recessit. *Part. act. pres.* مَهْنَمٌ; مَهْنَمٌ armiger. مَهْنَمٌ مَهْنَمَاتٍ مَهْنَمٌ vectigalis collector. مَهْنَمٌ مَهْنَمٌ, pl.

مَحْتَلٌ gerentes fasces : lictores. **مَحْتَلٌ مُّعَدِّلاً** sumpto sale consuetudinem nostram arripuit : nobiscum amicitiam contraxit. *Part.* pass. **مَهْمَلٌ** ; gramm. derivatus. **مُهْمَلٌ مَّهْمَلٌ** mente captus ; it. act. usurpat. ferens, portans ; **مَهْمَلٌ مَّهْمَلٌ** operam impendens, studiosus ; *impers.* **كَمْهَلٌ** cepi.

Ethpe. **مَهْمَلٌ** sublatus est, se extulit, se movit ; sumptus est, asportatus est, translatus est ; expugnatus est, captus est ; **مَهْمَلٌ مَّهْمَلٌ** reclusæ sunt portæ. **مَهْمَلٌ مَّهْمَلٌ مَّهْمَلٌ** sublatus est h. e. evanuit omnis timor a mente eorum.

Pa. **مَهْمَلٌ** erexit, sustulit. *Part.* pass. **مَهْمَلٌ مَّهْمَلٌ** ; superbus.

Ethpa. **مَهْمَلٌ** pass. et refl. ; trop. se extulit, superbivit, prævaluit, c. **مَهْمَلٌ** pers.

Aph. **مَهْمَلٌ** tulit, portavit ; abduxit, proficiscendum curavit : *intrans.*, se movit, profectus est ; castra movit.

Part. **مَهْمَلٌ** ; *subst.* v. *infra*.

مَهْمَلٌ actus efferendi, remotio, sublatio ; id quod portatur, onus, vectigal, tributum ; do-

num, munus ; ambitus *simbriarum* ; *apud poetas*, f., satyricum carmen.

مَهْمَلٌ dim., parvum onus.

مَهْمَلٌ, pl. **مَهْمَلَاتٌ** vectigal, tributum.

مَهْمَلٌ levatio, sublevatio, gestatio oneris, ereptio ; acceptio, lucrum ; portio ; portio cibi ; vectigal, tributum ; donum ; *apud gramm.* syllaba ; paradigm ; it. præmissa ratiocinii. **مَهْمَلٌ مَّهْمَلٌ** vel **مَهْمَلٌ مَّهْمَلٌ** susceptio oneris : sustinentia, patientia ; opera, labor ; studium, cura, sollicitudo. **مَهْمَلٌ مَّهْمَلٌ** sollicite, cum cura ; it. **مَهْمَلٌ** mortarium.

مَهْمَلٌ inferior pars *scapulæ*.

مَهْمَلٌ, pl. **مَهْمَلَاتٌ** id quod portatur, pondus, sarcina, onus.

مَهْمَلٌ derivatio.

مَهْمَلٌ elatio, superbia.

مَهْمَلَةً مَّهْمَلَةً **وَهْوَهْمَلٌ** **مَهْمَلَةً**

فِي أَكْنُونَ contra fastus insolentes irascitur Deus.

مَهْمَلٌ superbe.

مَهْمَلٌ, **مَهْمَلٌ** ereptio, expugnatio, motio, discessus ; exsilium ; onus.

مَهْمَلٌ profectio *agminum*.

مَهْمَلٌ amictus ; pallium.

مُهْكَمٌ et **مُهْكَمٌ**, pler. in pl. usurp. **مُهْكَمٌ**, ficus sycomorus. **أَنْتَ مُهْكَمٌ** ficus immatura. **مُهْكَمٌ** utres.

مُهْكَمٌ, fut. **تَعْكِفَ** percussit, allisit, tutudit. Part. **مُهْكَمٌ**; **مَهْكَمٌ** **مَهْكَمٌ** vestis evanidi coloris. **مَهْكَمٌ** mente captus; subst. v. infra.

Ethpe. **مُهْكَمٌ** pass.

Pa. **مُهْكَمٌ** allisit, confregit, penitus comminuit; cecidit, colaphum incussit; trop. vexavit, convitiis affecit; commovit. Part. pass. **مُهْكَمٌ**; lapideus, saxeus; f. emph. et subst. **مُهْكَمٌ** cædes; **مَهْكَمٌ** cædis reliquiæ h. e. qui cædem effugerunt.

Ethpa. **مُهْكَمٌ** cæsus est, allitus est, contritus est; vexatus est; obsoletus est color.

مُهْكَمٌ et **مُهْكَمٌ** ictus.

مُهْكَمٌ rupes; caverna.

مُهْكَمٌ saxeus, lapideus.

مُهْكَمٌ percussio, allisio; læsio mentis, mentis exiguitas.

مُهْكَمٌ allisio, percussio; ictus, alapa; trop. angustiæ, calamitas.

مُهْكَمٌ, inus.; ar. شَقَّ, scidit.

Pa. **مُهْكَمٌ** decidit, fregit.

مُهْكَمٌ et **مُهْكَمٌ** fissura, rima, ar. شَقَّ; via angusta; it. vestibulum, atrium.

مُهْكَمٌ, inus., cfr. heb. מְשֻׁבֵּשׁ, mentitus est.

Pa. **مُهْكَمٌ** mentitus est, febellit, perfide fecit, nefas egit; adulteravit rem; mœchatus est.

مُهْكَمٌ falsitas, mendacium, vanitas; nefas, perfidia, scelus.

مَهْكَمٌ وَهْكَمٌ Antichristus. **مَهْكَمٌ** كَمْ مَهْكَمٌ mundus fallax.

مُهْكَمٌ mendax, dolosus, deceptor; adulter.

مَهْكَمٌ infidelitas, adulteratio.

مُهْكَمٌ, fut. **تَعْكِفَ** solvit nodum, dissolvit compaginem, fregit; vitam absolvit; liquefecit, disjunxit; missum fecit, dimisit, repudiavit; liberavit; amovit a munere; trop. explicavit, elucidavit, dijudicavit; confutavit opinionem; superbiam retudit; irritum fecit, violavit leges, promissa; abolevit; rupit pacem, jejuniū; absolvit a peccatis sacerdos; nnq. permisit, lie-

tum fecit, (*id. q. ar.* حَالٌ; مُنْتَهٍ مِّنْ حَدَّدَهُ de mundo libera me; حَمَّلَ أَنْتَ sine eum abire. حَمَّلَهُمْ حَمَّلَ camelos destravit. حَمَّلَهُمْ وَقَ الْأَعْجَزُ alicujus sermonem refellit. حَمَّلَهُمْ تَحْمِلَ abdicavit; *intrans.*, se solvit; substitit, habitavit, commoratus est (*ar.* حَلَّ فِي), *c. a loci*; ingruit *malum*; castra posuit, obsedit *urbem*, *c. a*; quievit, desiit. حَمَّلَهُمْ حَمَّلَهُمْ cum prope erat ut e vita humana cederet. *Part. act. præs.* حَمَّلَهُمْ, حَمَّلَهُمْ; *f. emph et subst.* حَمَّلَهُمْ *v. infra.* *Part. pass. præt.* حَمَّلَهُمْ, حَمَّلَهُمْ, solutus; dissolutus, mollis; *trop.* profanus, licitus; حَمَّلَهُمْ مَعْدِلاً قَعْدَةً in sermo simplex et communis. حَمَّلَهُمْ vita cælebs *seu* soluta *a matrimonio, a seculi curis etc.* حَمَّلَهُمْ دَحْتَرَةً in domibus habitantes. حَمَّلَهُمْ مَجْمِيَةً obsidens urbem.
Ethpe. حَمَّلَهُمْ pass.; se solvit; cessavit; حَمَّلَهُمْ alvum solutum habuit; حَمَّلَهُمْ مُسْبِباً حَمَّلَهُمْ cessavit statim causa fletus; حَمَّلَهُمْ سَوْمَةً مَهْمَةً vertebræ dorsi eorum *tremore* dissoluti sunt. حَمَّلَهُمْ

scripto confutati sunt errores.
Pa. حَمَّلَ solvit, dissolvit; *ad portum appulit*; *nnq. ut* inhabitare fecit, *concedere* fecit; *intrans.* cœpit, initium habuit, *c. seq. fut.*, *vel c. ?, aut c. inf. præc.* حَمَّلَ; *impers.* حَمَّلَهُمْ وَنَائِاتٍ حَفَتُهُمْ cœperunt advenire anni famis. حَمَّلَهُمْ حَمَّلَهُمْ aedificare cœpit. حَمَّلَهُمْ حَمَّلَهُمْ tremere cœperunt. *Part. act.* حَمَّلَهُمْ; حَمَّلَهُمْ scribere aggredimur. *Part. pass.* حَمَّلَهُمْ, *pl.* حَمَّلَهُمْ debilitatus; paralyticus; *subst.* orbiculus fusi.
Ethpa. حَمَّلَهُمْ pass.; *trop.* حَمَّلَهُمْ حَمَّلَهُمْ in bonis stabilitus est, *seu* quiete eis fruitus est; *it., denom. a* حَمَّلَهُمْ, pransus est, prandium sumpsit; حَمَّلَهُمْ حَمَّلَهُمْ ad concedendum et manducandum ante *principem* invitati estis. *Part. ?* حَمَّلَهُمْ; gramm. pronuntiatione expressus.
Aph. حَمَّلَهُمْ *concedere* fecit, diversari, subsistere fecit; introduxit; inesse fecit *c. accus.* *vel a loci*, *aut rei.*

Part. act. مَحْمَدًا . *Part. pass.* مَحْمَدًا , f. emph. مَحْمَدًا , subst. v. *infra*.

مَحْمَدًا solutio *ligaminis*; dissolutio; separatio, rejectio, amotio, divertium; amissio, deficienia; *trop.* violatio *legis*; confutatio *libelli*, erroris; it. commoratio, quies; finis, cessatio. مَحْمَدًا وَخَاطِرًا doloris cessatione: sanatio. مَحْمَدًا وَخَاطِرًا solutio alvi. مَحْمَدًا actio tollendi et solvendi: commercium (*id. q. ar.* مَحْمَدًا ; (الأخذ والعطاء). وَخَفْرَةً وَخَفْرَةً abdicatio; *apud gramm.*, nomen accentus.

مَحْمَدًا solutio *ligaminis*, compaginis, etc.; paralysis.

مَحْمَدًا destructor.

مَهْمَةً , f. مَهْمَةً solvens, destruens; habitans, incola; it. incipiens.

مَهْمَةً , f. مَهْمَةً incipiens, novitius; recens, novus; præcox, primipara.

مَهْمَةً rudimentum, tirocinium, principium.

مَهْمَةً et مَهْمَةً initio, in principio; nuper.

مَهْمَةً destructor, subversor.

مَهْمَةً solutio *jejunii*, inde epulae, convivium. مَهْمَةً comensalis tuus.

مَهْمَدًا , pl. مَهْمَدًا articulus, junctura artuum; it. solutio. مَهْمَدًا فَهْمَدًا artuum luxatio; ap. gramm., articulus; articulatio.

مَهْمَدًا dissolutio; trop. mores dissoluti.

مَهْمَدًا , pl. مَهْمَدًا , heb. מִלְמָדָה , loricaria; it. arteria, commissura junctura, ar. شَرِيكَان ; شَرِيكَان aspera arteria (*gall. trachée-artère*).

مَهْمَنْتَن ad juncturas spectans.

مَهْمَنْتَن وَهْمَنْتَن loca insitioni apta in plantis.

مَهْمَنْتَن principium; exordium; liturgice antiphona; *apud gramm.*, subiectum, *per oppos.* ad مَهْمَنْتَن et مَهْمَنْتَن attributum.

مَهْمَنْتَن saepius præc. ?, pri- mum, recenter.

مَهْمَنْتَن dissolutio, paralysis.

مَهْمَنْتَن , مَهْمَنْتَن , c. suff. مَهْمَنْتَن , ap. Occid. مَهْمَنْتَن diversarium, habitaculum. مَهْمَنْتَن et مَهْمَنْتَن id.; it. castra.

مَهْمَنْتَن ; pl. مَهْمَنْتَن castra; exercitus, copiae; honorificus comitatus.

مَهْمَنْتَن , f. مَهْمَنْتَن solubilis, qui solvitur; لَا مَهْمَنْتَن indissolubilis.

مُعْدَّةٌ مُتَّدًا solutio.

أَعْنَمٌ et لِأَعْنَمٍ duo primi menses anni Syrorum, scil.: أَعْنَمٌ

مِنْهُ vel لِأَعْنَمٍ مِنْهُ Tischri primus, Octobri fere respon-

dens, ar. et تشرين الأول.

أَعْنَمٌ Tischri posterior, maxi-

mâ parte Novembri respon-

dens, ar. تشرين الثاني, pl.

uterque tischri seu autumnus.

أَعْنَمٌ autumnalis.

مَنْدَلٌ cupressus sempervivus,

cfr. مَنْدَلٌ.

عَنْتٌ, fut. لِعَنْتٍ exsiccatus est, aruit. Part. præt. مَسْحَى siccus.

Pa. مَسْحَى siccatum, arefecit; it. ar. سَرَبٌ dispersit, propagavit; cfr. سَرَبٌ fluxit.

Ethpa. أَحْمَدَتٌ exsiccatus est; propagatus est, se propagavit; in plures species divisus fuit, distinctus fuit; recensitus est; it. invenit.

مَتَّهُ , مَتَّهُ , pl. مَتَّهُ res gesta et transmissa, eventus, historia, narratio, tractatus; negotium, causa; quod attinet ad.

مَتَّهُ , emph. مَتَّهُ , pl. مَتَّهُ generatio, prosapia; genus, tribus, gens; cfr. ar. سُزْبَةٌ ,

agmen avium; turma; it. مَنْدَلٌ, al. مَنْدَلٌ, funis quo taurus ligatur; solea.

مَنْدَلٌ, dimin. a مَنْدَلٌ, nugæ.

مَنْدَلٌ ariditas; ventus urens.

مَنْدَلٌ et مَنْدَلٌ siccus, aridus.

مَنْدَلٌ ariditas; trop. exilitas mentis; it. genus mantice sine capite.

مَهْوَصَنْتَا , pl. مَهْوَصَنْتَا , vox pers., cupressus sempervivus cfr. targ. شَرَبَنْ , ar. شَرَبَنْ et مَنْدَلٌ , s. هَنْ .

شَلَوَارٌ , pers.-ar. مَنْدَلٌ , saraballum, seu bracæ latae usque ad pedes pertingentes.

مَنْدَلٌ v. denom., vestivit aliquem saraballo.

مَلْقَدٌ laqueus.

مَنْدَلَهُمْ , pl. مَنْدَلَهُمْ funiculus, laqueus; laqueolus globuli vestiarii, ansula chlamydis; cfr. مَنْدَلٌ et ar. زَبَقَةٌ id.

لَامْبَسٌ, pl. لَامْبَسٌ , pers. لَامْبَسٌ , ar. سِرَاجٌ , lampas, lucerna; lychnuchus.

مَنْهَلٌ, fut. لِمَنْهَلٍ v. denom., incendit.

Ethpe. مَنْهَلٌ splenduit, illuxit.

Palp. مَنْهَلٌ vana ostendit.

Ethpalp. **أَعْدَقْتُ** hallucinationes passus est.

Aph. **أَحْمَى** perstrinxit oculos lux, hebetavit.

أَنْكَحْتُ curator lucernarum.

أَنْكَحْتُ hallucinationes, phantasmata ; it. scintillæ ignis.

أَنْكَحْتُ nomen plantæ indicæ ; fructus myristicæ, cfr. **جَرْبَةٌ** corrupt. hujus vocis.

أَنْكَحْتُ, c. deriv., v. s. **أَنْكَحْتُ**.

أَنْكَحْتُ et **أَنْكَحْتُ** amygdala amara.

أَنْكَحْتُ cadaver.

Aph. **أَنْكَحْتُ** eruit, effudit oculum.

أَنْكَحْتُ passer seu turdi species uvas edens et locustas.

أَنْكَحْتُ usit. in part. præter.

أَنْكَحْتُ luxuriosus, libidinosus ; cfr. ar. شَرَّه recreavit ; virginem defloravit.

Ethpe. **أَعْدَقْتُ** recreatus est, oblectatus est ; gaudio exsultavit ; se oblectavit, insectatus est rem, studuit rei, c. **كَذَّ**, nnq. **كَذَّ**.

Pa. **أَنْكَحْتُ** ad luxuriam allexit ; oblectavit ; corruptus, delevit.

Ethpa. **أَعْدَقْتُ** pass.; se oblectavit.

Aph. **أَنْكَحْتُ** oblectavit, recrea-

vit ; ad luxuriam incitavit.

أَنْكَسْتُ libidinose.

أَنْكَسْتُ luxuria, libido, vita dissoluta.

أَنْكَحْتُ, fut. **أَنْكَحْتُ** laceravit ; cfr. usitat. **أَنْكَحْتُ** incidit, ar. شَرَط id.

Pa. **أَنْكَحْتُ** discerpsit, laceassivit hostes.

أَنْكَحْتُ, pl. **أَنْكَحْتُ**, ar. شَرْخَةٌ, satelles, satellites.

أَنْكَحْتُ, pl. **أَنْكَحْتُ** species la thyridis planta (gall. épurge).

أَنْكَحْتُ millepeda ; cfr. لِعَنْ.

أَنْكَحْتُ pestis, lues.

أَنْكَحْتُ, fut. **أَنْكَحْتُ** et **أَنْكَحْتُ** relictus est, superfuit ; per venit, redactus est ad talem statum, c. **لَا** vel **لَا** ; obtigit res, præsto fuit ; inclinavit ad ; persistit, intentus man sit, c. **لَا** ; cfr. ar. تَرْكَ reliquit. **أَنْكَحْتُ** لَادِبَرْتَا periit. **أَنْكَحْتُ** مَوْتًا وَمَكْحُولًا mortuus qui corruptioni pabulum evasit.

Aph. **أَنْكَحْتُ** reliquit ; perduxit, reduxit, pervenire fecit, c.

أَنْكَحْتُ, vel **لَا**; كَبِدَهَا وَأَكَبَهَا أَوْمَ حَفَعَهُهُ مَكْبَدًا Dei scientiæ rem ejus relinquere h. e. committere decet.

رِيلْيُوْنْهَى reliquiae, residuum, reliqua pars; reliqui, reliqua; رِيلْيُونْهَى cæteri; adverb. اَنْهَى et cæterum; رِيلْيُونْهَى compendiosa forma: et cætera; it. fundamen-tum.

reliquiae, posteritas ; it.
vel absol. reliquiae Sanctorum.

لَتْهُ reliquo, restans; *im-*
pers. reliquum est, restat.

مَنْحَلٌ residuum.

مُهْمَّةٌ vitium oculi ; it. et **مُهْمَّةٌ**
felis, cfr. **مُهْمَّةٌ**.

﴿يَوْمَ مَرَدِّعٍ﴾ *in us.* — *Ethpa.* ﴿أَنْذَلْتُكُمْ﴾
dimissus est.

אֲגַרְוָתָה, f. אֲגַרְוָתָה ægrotus.

Ethpe. οὐδεὶς pass.

Pa. & ~~;~~ dissecuit in multas
partes.

مُهْمَّةٌ, *ar.* سُرْمَةٌ, *intestinum rectum.*

|مَدْعُونٌ| lectus suspensus.

جَنْجَنْ *planta gossypii*.

لَهْوَنْ canis aureus.

לְמַזֵּה, v. s. **לְזֵה**.

مَهْوَنْدِسْ *f.*, pars plantæ in qua reconditur semen: cortex malii granati; *it.* æstus.

عَرَبَ, fut. **عَرَبَ** lapsus
est, decidit, c. **أَوْ** vel **عَرَبَ**;
translate erravit, peccavit,
defecit. **أَوْ** **عَرَبَ** **عَرَبَ** a spe
defecit : desperavit. Part.
præs. **عَرَبَ**; f. emph., et
subst. v. *infra*.

Ethpe. اَثْبَتْ pede vacillavit,
lapsus est; *trop.* deliquit.
اَثْبَتْ وَهُمْ اَثْبَتْ deliqui rem
furando.

Aph. ~~et~~ in lapsus induxit;
delinquere fecit, ad peccan-
dum allexit; *intrans.* lapsa-
vit, deliquit.

مَنْجَدًا lapsus, vacillatio pedis.
مَهْوَذًا locus lubricius; lapsus;
trop. error, peccatum, delici-
 tum, *pl.* **مَهْوَذَاتٍ**.

lapsio, lapsus; muri ruina,
muri pars dejecta, hiatus.

لَهْوٌ et **لَهْوَةٌ** viscosus.

لَمْحَةٌ delictum, error.

μάστιγος lubricus.

|**لَعْدَوْنَ** viscositas ; lubricum.

لُبْرِيْكُوم, pl. لُبْرِيْكُومْ اللُّبْرِيْكُومْ lubri-
cum, locus lubricus, lapsus.

فَجَنَّ se contorquendo movit,
palpitavit; calcitravit.

هُجْرَةٌ tumor, scrofulæ.

حُنَفَة asperitas; *it.* scoria; firmus, stercus *boum*.

حُنَفَة rudis, asper, inurbanus.

حُنَفَة, *heb.* שְׁרֵצָה, *fut.* תַּשְׁרֵצֶן repdit.

حُنَفَا, *pl.* חַטְוָא herinaceus; scarabeus; reptile.

حُنَفֹּם, *pl.* חַטְוֹמָה, **حُنְזֹבָה**, *reptilis.* **حُנְזֹבָה** e genere reptilium.

حُنְזָבָה mespilus *arbor.*

حُنَفָּה, *heb.* שְׁרֵק, *fut.* תַּשְׁרֵק sibilavit. *Part. pass.* حُנְמָה; resonans; cavus.

Aph. أَحْنَمَ sibilavit; *it. ar.* أَخْرَق, fulsitus.

حُنְدָה, *pl.* חַטְמָה putamen ovi.

حُنְדָה, *pl.* חַמְמָה, *sibilum;* fistula; *apud gramm.*, sibilantes litteræ, uti ۱, ص, ۲.

حُنְدָה et **حُنְدָה** raceematio; spicilegium.

حُنְدָه et **حُنְدָه** tinnitus gravis aurium.

حُنְدָه merops *avis*; *cfr. ar.* شَقَرَاق, *picus viridis.*

حُنְدָה *ut* **حُنְدָה**.

حُنَفَة, *fut.* تُفَّ firmus, stabilis factus est, convaluit; *trop.* verus, verax fuit; ratum est; eventu, exitu comprobata est

res; evenit, successit consilium. **حُنَفَة** سُلْكَة exitu comprobabuntur somnia ejus;

it. certior factus est, *c. acc.* rei.

حُنَفَة قَدْرَتْ يَوْمَنْ de jussu tuo nobis constitut; *impers.* **حُنَفَة** constitut, certum factum est;

statutum est; **حُنَفَة**, *ut* pro certo habeas. **حُنَفَة** *حُنَفَة* constiterat; statutum erat.

حُنَفَة كَذَنْ وْ كَعْمَة حَسْرَة مَحْسَرْ compertum est vos exploratores esse. *Part. præs.* حُنَفَة.

Pa. **حُنَفَة** firmavit, stabilivit; roboravit, corroboravit, *ei* animum addidit, *c. acc.* rei; *trop.* affirmavit, confirmavit, ratum habuit, *c. acc.* rei.

Ethpa. **حُنَفَة** *pass.*; *impers.* **حُنَفَة** constitut, certum evasit.

Aph. **حُنَفَة** confirmavit; ad eventum perduxit; *trop.* verum censuit, credidit, certo scivit, *c. acc.* rei *vel* *c. acc.* rei; *it.* *intr.* verax fuit, fidelis stetit *promissis*, *c. acc.* rei.

حُنَفَة *أَحْنَمَة* vera probabi verba vestra;

حُنَفَة *حَانِمَة* justitiae nostræ credere noluit. *Part. act. et puss.* **حُنְمَة**, **حُنَمَة**; verax; certus.

حَدْوَةُ firmitas, veritas; pactum firmum, foedus; sponsalia; adverb. حَدْوَةً vere, revera.

حَدْوَةُ اَنَّ veritas; اَنَّ suffragium ejus.

حَدْمَانِيُّ, f. emph. اَنَّ firmus, solidus; integer, validus, sanus; verax, fide dignus, verus; certus; impers.

حَدْمَانِيٌّ mihi certum est; subst. cui res committitur, commissarius; in f. emph. subst. res vera, rectum, veritas.

حَدْمَانِيُّ soliditas; veritas, fidelitas.

حَدْمَانِيٌّ et حَدْمَانِيَّةٌ firmiter, vere.

حَدْهُوَةُ, f. affirmitio, affirmatio; fides, auctoritas. حَدْهُوَةُ وَبِهِ حَدْهُوَةُ وَمُبِهِ

حَكْمَانِيُّ jusjurandum est affirmatio rei coram Deo facta.

حَكْمَوْنِيُّ affirmativus, confirmativus.

حَمْدَانِيُّ, emph. اِلْجَاهُ nexus; it. ut seq.

حَمْنَانِيُّ, f. ar. حَرْبَةُ, umbilicus; حَمْنَانِيُّ et حَمْنَانِيُّ id.; it. اِنْهَى ut حَمْنَانِيُّ, σειρά, funiculus, catena.

حَمْنَانِيُّ germen recens et tenuerum; ramus recens et mollis.

حَمْنَانِيٌّ firmitas, animi constantia.

حَمْنَانِيَّةٌ firmiter.

حَمْنَانِيٌّ, neō-ar. شَلَشٌ, et شَرْشٌ, heb. שָׁרֵשׁ, radix, origo, ima pars rei; it. glomus convolutorum filorum. حَمْنَانِيٌّ fulmina. حَمْنَانِيٌّ هُدْرَهُ radicitus, funditus.

Pa. حَمْنَانِيٌّ et **Aph.** حَمْنَانِيٌّ radice firmavit.

Pali حَمْنَانِيٌّ extirpavit.

حَمْنَانِيٌّ radix, fundamentum.

حَمْنَانِيٌّ radicalis.

حَمْنَانِيٌّ firmitas, corroboratio.

حَمْنَانِيٌّ, v. حَمْنَانِيٌّ.

حَمْنَانِيٌّ abscondit, occultavit.

حَمْنَانِيٌّ, v. حَمْنَانِيٌّ.

حَمْنَانِيٌّ, v. s. حَمْنَانِيٌّ.

حَمْنَانِيٌّ, pers. سُوسَمَارٌ, chamaeleon.

حَمْنَانِيٌّ gutta, v. s. حَمْنَانِيٌّ.


حَمْنَانِيٌّ et حَمْنَانِيٌّ testudo.

حَمْنَانِيٌّ patrinus; v. s. rad. حَمْنَانِيٌّ.

حَمْنَانِيٌّ etc. v. s. حَمْنَانِيٌّ.

حَمْنَانِيٌّ, heb. חַמְנָן, usitat. tant.c. 1 prosth. in forma حَمْنَانِيٌّ, fut.

حَمْنَانِيٌّ, imper. حَمْنَانِيٌّ, bibit, absorpsit. Part. act. حَمْنَانِيٌّ, حَمْنَانِيٌّ;

<i>c. suff.</i> بَعْدَ مَهْمَدْ . <i>Part. pass.</i>	mentum horreorum ; <i>cfr.</i> بَعْدَ
مَهْمَدْ potatus.	fundus ; <i>it.</i> , <i>c.</i> بَعْدَ compos.,
<i>Ethpe.</i> بَعْدَ pass.	بَعْدَ et ap. Orient. بَعْدَ أَصْدَمْ ,
<i>Aph.</i> بَعْدَ أَصْدَمْ , <i>fut.</i> بَعْدَ biben- dum dedit.	fundamentum, <i>pl.</i> بَعْدَ أَصْدَمْ .
بَعْدَ potus.	بَعْدَ أَصْدَمْ وَمِنْهُا fundamentum anni : littera dominicalis.
بَعْدَ et بَعْدَ potator.	<i>Pa.</i> بَعْدَ et بَعْدَ مَهْمَدْ v. denom.,
بَعْدَ , emph. بَعْدَ مَهْمَدْ , <i>c. suff.</i>	fundavit.
بَعْدَ , emph. بَعْدَ مَهْمَدْ , ap. Occid.	<i>Ethpa.</i> بَعْدَ pass.
بَعْدَ مَهْمَدْ compotatio, potus ;	بَعْدَ confirmatio.
convivium. بَعْدَ مَهْمَدْ aquarium (gall. abrevoir) ; <i>it.</i>	بَعْدَ fundamentum ; <i>cfr.</i> بَعْدَ .
convivium ; بَعْدَ مَهْمَدْ compo- tator.	 , heb. בָּשָׂר , fut.
بَعْدَ مَهْمَدْ compotatio, convivium, convivium nuptiale ; tricli- nium ; بَعْدَ مَهْمَدْ id.	בָּשָׂר plantavit ; trop. fun- davit. <i>Part. pass.</i> מְלָא ; مَهْمَدْ حַתּוֹתָה Paradisus plan- tis amœne consitus.
بَعْدَ مَهْمَدْ potabilis.	<i>Ethpe.</i> בָּשָׂר pass.
 , <i>inus.</i> <i>cfr.</i> ar. شَقْ , et أَسْتَقَ , <i>id. q.</i> أَسْدَى texuit.	בָּשָׂר , neo - ar. شَقْ , plantatio ; it. planta ; trop. fundatio ; pl.
<i>Aph.</i> بَعْدَ texuit. <i>Part. pass.</i>	בָּשָׂר , trop. posteri.
بَعْدَ مَهْمَدْ ; f. emph.	בָּשָׂר , pl. בָּשָׂר מְתָחָדָה planta.
بَعْدَ مَهْمَدْ contextus.	בָּשָׂר מְתָחָדָה plantaria.
بَعْدَ textura, ar. شَدَى , heb. בָּשָׂר .	בָּשָׂר , v. s. بَشَرَ .
بَعْدَ مَهْمَدْ textura, jugum, vel ra- dius textoris.	بָּשָׂר , v. s. بَشَرَ .
بَعْدَ مَهْمَدْ duas trabes jugi textori- rii circa quas obvolvitur fi- lum textoris.	بָּשָׂר ludus ; nugae, <i>id. q.</i>
بَعْدَ مَهْمَدْ fusi textoris (gall. bo- bines).	בָּשָׂר חֲנִיתָה , v. s. חֲנִיתָה .
بَعْدَ , c. بَعْدَ usurpat., purga-	 , fut. تَعْدَدْ ; sociavit,
	inus. in Pe., <i>cfr.</i> شَفَّ ; al.
	dilexit, inde تَعْدَدْ amarem !
	تعْدَدْ utinam !
	تعْدَدْ amor.

مَهْمَافُ *et deriv., v. s. لَهْلَهْ.*

مَهْلَمَهْ, *talm. פָּתָח et ar., c. metath. , عَكَس fut. مَهْلَمَهْ siluit, tacuit, praetermisit, quievit a re, c. acc. vel مَهْلَمَهْ حَبْ وَمَهْلَمَهْ مَهْلَمَهْ et quis faciet ut silentio taceretis: atque utinam taceretis!*

Pa. مَهْلَمَهْ silere fecit, mutum reddidit, sedavit. *Part. pass.* مَهْلَمَهْ ad silentium redactus, silens.

Ethpa. مَهْلَمَهْ obmutescere coactus est, obmutuit, contacuit; silentio tecta est *res*, praetermissa est *persona*.

مَهْلَمَهْ silentium; مَهْلَمَهْ tacite.

مَهْلَمَهْ et communius مَهْلَمَهْ tacens, silens, tacitus.

مَهْلَمَهْ silentii impositio.

مَهْلَمَهْ tacitus, taciturnus; *subst. in pl. f.* مَهْلَمَهْ muta animantia.

مَهْلَمَهْ taciturnitas.

مَهْلَمَهْ et مَهْلَمَهْ tacitus, obmutescens; silere faciens.

مَهْلَمَهْ, *pers. هَلْخَلْ*, umbraculum, umbella.

مَهْلَمَهْ, *c. f. nomin. usurp., ar. سَيْنَة, heb. שְׁנִי, emph. مَهْلَمَهْ et مَهْلَمَهْ c. masc. nomin., ar. شَنَّى, heb. שְׁנִי, sex; c. suff. مَهْلَمَهْ: cum procl., مَهْلَمَهْ; adj. c. وَ, مَهْلَمَهْ vel مَهْلَمَهْ sextus; مَهْلَمَهْ sexta. مَهْلَمَهْ لَهْلَهْ Hexameron; مَهْلَمَهْ مَهْلَمَهْ, مَهْلَمَهْ مَهْلَمَهْ, nnq. مَهْلَمَهْ c. masc. nom. sexdecim, cum fem. nom. مَهْلَمَهْ مَهْلَمَهْ et مَهْلَمَهْ مَهْلَمَهْ, nnq. مَهْلَمَهْ مَهْلَمَهْ; subst. مَهْلَمَهْ مَهْلَمَهْ dies decima sexta mensis.*

مَهْلَمَهْ et مَهْلَمَهْ, *c. procl. مَهْلَمَهْ*, sexaginta.

مَهْلَمَهْ et مَهْلَمَهْ sexenti.

مَهْلَمَهْ sextus, f. مَهْلَمَهْ sexta; فَرْعَوْنَهْ مَهْلَمَهْ Hexapla.

مَهْلَمَهْ sexangulum.

مَهْلَمَهْ sexagesimus numerus.

مَهْلَمَهْ pars sexta.

مَهْلَمَهْ v. denom., ad numerum sextum auxit.

L seu oī vicesima secunda ea-
que ultima Alphabeti Syro-
rum;

1° *Valet numerice: L = 400;*
L = 4,000,000; L, quadringentesimus.

٢° *Respondet tum heb.* ﴿ , ar.
ت , tum ar. ث , heb. ش , ex. :
كَتَبَ ﴿ ; مَكَدَّ , heb. مَكَدَّ , ar.
أَكْدَمَ , heb. مَكَدَّنَ , ar.
ثَلَاثَتْ , it. heb. ثَلَاثَتْ , ar. ط ;
مَعْمَدَأَ , heb. مَعْمَدَأَ , ar.
قَنْطَ .

4º *Äquivalet generatim litterae græcae 6, raro 7: cfr.*
تُحَمِّلُهُمْ *Tūmīlūm, Timo-*

theus; sed ~~τάγμα~~, τάγμα,
exercitus, ar. طففة.

5º *Littera servilis est, quae rādī nominis et verbī p̄f̄gitur aut affigitur ad designandum* 1º *nomen actionis* : **أَعْجَبْهُمْ** auxilium, a rad. **عَجَّبْ** ;
 2º *nomen agentis* : **كَلَّا** incōla a **كَلَّ** ; 3º *genus femininum* : **عَيْنَ** vitulus, f. **عَيْنَاتْ** ; 4º *personas et flexiones verbi* ; cfr. **أَنْتَمْ** 2ª pers. p̄f̄t. et **أَنْتَمْ** 2ª pers. m. fut. v.
أَنْتَمْ ; 5º *formas derivatas* : **أَنْتَمِي** etc. a **أَنْتَمْ**

أَخْلَقَ، v. أَخْلَقَ.

1. $\int_0^x f(t) dt$, 2. $\int_x^0 f(t) dt$.

negotiation, *v. negotiatio*, *n.*

جـلـد ، ٢٠١٩

۱۷

tio per inspirationem facta.

οἰδότι, *οἰδότι*, *οἰδότι* et
οἰδότι f., θέατρον, theatrum.

هـ، ۵۰۱ تھوڈویا، servus Dei.

Θεοτόκιον, titulus
Genitricis Dei.

وَكُلُّهُمْ لِلَّهِ وَرَبِّ الْعَالَمِينَ

Θεολόγος, theologus.

τεολογία et **τεολογίαν** θεολογία,

Ἄοι Θεός, Deus.

መ—ቃዣዎች ብርሃንኩና, ti-
mens Deum.

መጀመሪያ በዚምሮና, portans
Deum, Deo indutus, inspira-
tus.

الْمُؤْمِنُونَ Theopaschitæ *hæ-retici.*

تَوْهِیْلٌ, pl. تَوْهِیْلٌ ثِيَارِیْخُ,
theoria, speculatio, contemplatio;
vita contemplativa,
per oppos. ad تَوْهِیْلٌ vita
activa.

الْمُهْمَّاْتُ theoricus, contemporatus, speculatus.

1717, v. 171.

أَكْمَلَ et أَلَّا θέλασσα , mare.

גַּמְלָן, *heb.* גַּמְלָן, duplex, geminus fuit, usitat. *adj. in Peal in part. præs.* גַּמְלָן, *f.* גַּמְלָן geminus, gemellus, duplex, *ar.* גַּמְלָן, *pl.* גַּמְלָן Gemini *constellatio*; *f. pl.* גַּמְלָן, *subst.* valvæ bifores *januæ*. *Ethpe.* גַּמְלָן conjunctus, consociatus est; se conjunxit.

Pa. **☒IL**, *ut usitat. seq.,* *socia-*
vit. Part. pass. **☒LDO**.

Aph. \aleph ل *conjunxit. Part. act.*
 \aleph ل *. Part. pass.* \aleph ل ,
 \aleph ل ; duplex, gemellus, *pl.*
 f. \aleph ل , *emph.* \aleph ل .

|Ləsə|L geminatio.

|Δωματιον valvae januae ; diplois.
|Δωματιον geminatio, conjunctio.

أَنْتَ *f.*, in sing. usit. tant. in
form. contr. **إِنْ**, **إِنْكَ**, ar.
تَيْنٌ, *ficus*, *pl.* **أَنْتَنَّ**; **فَخْرَنَّ**
سَمَّقَنَّ *sycomorus*. **أَنْتَنَّ**
مَحْمَقَنَّ *caricæ*; *it. ut* **أَنْتَنَّ**.

فَلَوْسِي nom. unit., ar. **فَلَوْسِي**, **ficus**; it. *al. sensu*, v. s. **لِ**.

Lfurunculus magnus, ul-

|ʌ|L ansula chlamydis etc., v.
s. L'lt.

۱۶۰ اَمْهُوْا لَ اَمْهُوْا et θησαυρός, thesaurus.

۱۶۱ اَفْلَى, v. اَفْلَى.

۱۶۲ اَعْهَنْا θαύβία, planta ferulæ communi similis; it. θάυβος, thapsus, herba tinctoria.

۱۶۳ اَمْلَى, v. اَمْلَى.

۱۶۴ اَنْجَلَّ animadvertisit, cfr. heb. הַאֲנָגֵל et ar. اَنْجَلَّ infixit oculos in rem.

۱۶۵ اَوْمَدَا, ut اَوْمَدَا, residuum paleæ. ۱۶۶ اَنْجَلَّ, pl. اَنْجَلَّ conscientia, intentio.

۱۶۷ اَنْجَلَّ, v. اَنْجَلَّ.

۱۶۸ اَصْلَى et اَصْلَى f., sine st. emph., heb. ظَرِيرٌ, orbis terrarum. ۱۶۹ اَحْكَمْا universalis, oecumenicus. مَعْقُومْا اَحْكَمْا commentator universalis: cognomen Theodori Mopsuesteni.

۱۷۰ اَحْتَلَ ligusticum planta.

۱۷۱ اَحْتَنَّ, ar. تَبَنَّ, palea.

۱۷۲ اَحْسَلَ, fut. اَسْتَهْسَلَ et اَسْتَهْسَلَ quæsivit, petiit, postulavit c. acc. pers. et rei; oravit, exoravit; اَحْسَهْ مُلْكًا حَسَّةً وَمَلْكَةً, flagitarunt ut vitæ salus Caliphæ daretur; it. insecurus est, ar. تَبَعَ; exegit; اَحْسَنْ مَنْ مَنْ وَحْشَدَا pecuniaæ summam cum fœnore exigent;

tes. اَسْتَهْسَلَ rationem exegit ab eo; ultus est, vindicavit, punivit; ap. gramm. presse pronuntiavit seu induavit litteram. اَنْتَمْ وَهُنْ بَنْ حَسْمٍ وَهُنْ بَنْ حَسْمٍ petiit ab eis ut idolis sacrificarent.

Ethpe. اَنْجَلَّ pass.; se vindicavit, c. حَسْمًا . اَنْجَلَّ مَهْمَدًا مَهْمَدًا pœnas dabis. Part. مَهْمَادَمْ ; سَهْدَمَا وَهَدْمَهَقَهْ مَهْمَادَمْ culpam patrum vestrorum luetis.

۱۷۲ اَحْدَى ultio, vindicta.

۱۷۳ اَحْدَمْ, c. suff. اَحْدَمْ , اَحْدَمْ , اَحْدَمْ , pl. اَحْدَمَاتْ quæstio, petitio, postulatio; exactio, vindicta, pœna; اَحْدَمْ وَاهْدَمْ vectigalia.

۱۷۴ اَحْمَدْ postulans, exactor, vindicator, ultiator.

۱۷۵ اَحْمَدْ, heb. حَمَدَ, ar. حَمَدَ, fut. حَمَدَ et حَمَدَ fregit, contrivit, discerpsit; trop. profligavit hostes, cfr. تَبَرَّدَ perdidit aliquem. Part. act. اَحْمَدْ , Part. pass. اَحْمَدْ اَحْمَدْ . كَحْمَدَ contritus corde; humiliis; it. abjectus, vilis; subst. in pl. f. اَحْمَدَاتْ apostemata.

Ethpe. اَنْجَلَّ pass.; هَلْلَاتْ دَكْحَدَهْ se humiliaverunt.

Pa. نَهْلَ confregit, contrivit.
Ethpa. نَهْلَلِ pass.
 نَهْلَ fragmentum.
 نَهْلَ contractio, contritio; præda; fragmentum *rei*; profligatio, clades, ruina; *trop.* contritio cordis, angustiae; *f. emph.* نَهْلَ ruina, clades; *it.* pars hymni.
 نَهْلَ contractio, fractura.
 نَهْلَ id.
 نَهْلَ frangens; separans, dissolvens.
 نَهْلَ sedimentum, fimus, *v. s.* نَهْلَ.

نَهْلَ et نَهْلَ, pers.-ar. نَهْلَ, corona, diadema; *it.* rector.
Pa. نَهْلَ v. denom., tiara, diademate ornavit.
Ethpa. نَهْلَلِ pass.
 نَهْلَ, نَهْلَ f., pl. نَهْلَتْلَ, نَهْلَتْلَ et نَهْلَتْلَ تَخْرِبَخَ, ordo; agmen, caterva; mandatum. نَهْلَ ءَذْلَ ejusdem ordinis.
 نَهْلَلَ, *v. s.* نَهْلَ.
 نَهْلَلَ, pugna, certamen; *cfr.* نَهْلَ.
 نَهْلَلَ, *inus.*, ar. نَهْلَ, mercatus est.
Pa. نَهْلَ mercaturam exercuit.

Part. pass. نَهْلَلَ mercatura acquisitus, lucrificatus.
Ethpa. نَهْلَلِ mercatus est, negotiatus est, lucratus est; comparavit. نَهْلَلِ نَهْلَلِ mercaturam fecit. نَهْلَلِ مُعَاوِنٌ وَمُسْتَأْنِدٌ spiritualia luca sibi comparavit.
 نَهْلَلِ, نَهْلَلِ, st. est.
 نَهْلَلِ, pl. نَهْلَلِ mercatura, negotiatio; lucrum, merces.
 نَهْلَلِ emporium.
 نَهْلَلِ بِزْجَهْلَلِ merces emendæ et vendendæ.
 نَهْلَلِ et نَهْلَلِ, ar. نَهْلَلِ, mercator.
 نَهْلَلِ negotiationis viâ.
 نَهْلَلِ, نَهْلَلِ et نَهْلَلِ herba, gramen; vernum tempus; pinguedo; *pl.* نَهْلَلِ.
 نَهْلَلِ et نَهْلَلِ vernalis.
 نَهْلَلِ, c. suff. نَهْلَلِ, ar. نَهْلَلِ, pl. نَهْلَلِ m., st. est. نَهْلَلِ, c. suff. نَهْلَلِ, mamma, uber.
 نَهْلَلِ, v. s. نَهْلَلِ.
 نَهْلَلِ, v. s. نَهْلَلِ.
 نَهْلَلِ, fut. نَهْلَلِ moratus est.
Pa. نَهْلَ retardavit, distulit, impedivit, prohibuit; *intrans.* tardavit, moratus est; *cfr.* ar. نَهْلَ et نَهْلَ divagatus est.
Ethpa. نَهْلَلِ pass.; *it.* mora-

tus est ; abstinuit, destitit, c. **حَدَّمْ** vel **حَدَّمْ رَئِي**. **حَدَّمْ مَهْمَنْدَهْ** cur ita moramini ? **مَهْمَنْدَهْ** dilatio, mora, retardatio ; **مَهْمَنْدَهْ نِي**, sine mora. **مَهْمَنْدَهْ** mora, dilatio. **مَهْمَنْدَهْ لِهَرْ**, pl. **مَهْمَنْدَهْ لِهَرْ** theatrum ut **مَهْمَنْدَهْ**. **مَهْمَنْدَهْ يَاهْلَهْ** pl., θεατρικός. res scenicae ; spectacula. **مَهْمَنْدَهْ كَهْيَاهْلَهْ** ut **مَهْمَنْدَهْ كَهْيَاهْلَهْ**. **مَهْمَنْدَهْ يَاهْلَهْ** θεοτόκος, Dei Genitrix, Virgo Maria. **مَهْمَنْدَهْ كَهْيَاهْلَهْ** θέλημα, voluntas. **مَهْمَنْدَهْ** c., heb. **אַבָּהָה**, abyssus, profunditas ; vorago. **مَهْمَنْدَهْ كَهْيَاهْلَهْ** cum in altum mare provectus esset.

مَهْمَنْدَهْ id.

مَهْمَنْدَهْ voraginosus.

مَهْمَنْدَهْ θεμέλιον, fundatum.

مَهْمَنْدَهْ form. apoc. fut. v. **مَهْمَنْدَهْ** pro **مَهْمَنْدَهْ**.

مَهْمَنْدَهْ, fut. **مَهْمَنْدَهْ** admiratus est, c. acc., vel **مَهْمَنْدَهْ رَئِي** ; stupuit. Part. præter. **مَهْمَنْدَهْ** ; adject. stupendus, mirabilis.

Aph. **مَهْمَنْدَهْ** in admirationem rapuit, obstupefecit.

مَهْمَنْدَهْ, ap. Orient. **مَهْمَنْدَهْ**, stupor,

admiratio ; **مَهْمَنْدَهْ** illud vero magis mirandum est quod. **مَهْمَنْدَهْ** stupor ; it. languor, sterilitas ; phthisis. **مَهْمَنْدَهْ** mirabiliter. **مَهْمَنْدَهْ** admiratio. **مَهْمَنْدَهْ**, **مَهْمَنْدَهْ** mirabilis, mirandus. **مَهْمَنْدَهْ** admiratio, stupor. **مَهْمَنْدَهْ** θέρος, aestas. **مَهْمَنْدَهْ** θέρμη, calor, aestus. **مَهْمَنْدَهْ** θέρμης, lupinus legumen, ar. **مَهْمَنْدَهْ**. **مَهْمَنْدَهْ**, imper. pl. v. **مَهْمَنْدَهْ** q. v. ; it. nomen ultimæ litteræ Alphabeti Syrorum. **مَهْمَنْدَهْ** ad litteram **مَهْمَنْدَهْ** pertinens.

مَهْمَنْدَهْ et **مَهْمَنْدَهْ**, fut. **مَهْمَنْدَهْ** pœnituit, doluit, ægre tulit. **مَهْمَنْدَهْ** **مَهْمَنْدَهْ** me pœnituit ; **مَهْمَنْدَهْ** **مَهْمَنْدَهْ** id. Part. præs. **مَهْمَنْدَهْ**, **مَهْمَنْدَهْ**. Part. præt. **مَهْمَنْدَهْ**, **مَهْمَنْدَهْ** ; moestus.

Ethpe. **مَهْمَنْدَهْ** pœnitentia motus est.

Pa. **مَهْمَنْدَهْ** pœnitere fecit ; increpuit.

Aph. **مَهْمَنْدَهْ** pœnitere fecit, dolore affecit. Part. pass. **مَهْمَنْدَهْ**, **مَهْمَنْدَهْ** ; pœnitentia motus, dolens, tristis.

۱۵۰ et ۱۵۱ pœnitentia, animi dolor.

۱۵۲ pœnitens.

۱۵۳ pœnitentia ; retrac-tatio erroris.

۱۵۴, ar. بَعْدٌ, heb. שָׁמַעַת, fut. تَوَكَّلَ rediit, reversus est ; trop. resipuit, pœnituit ; al. sensu v. *infra*. اَدْهَمْتُ convaluit aegrotus.

Ethpe. اَرْتَلْتُ reiteratus est, redditus est.

Aph. آتَحَ redire fecit, reddit. فَعَلَمْتُ respondit ei. اَتَحَدَتْ خَلَقْتُ mihi occurrit in mentem *res*.

۱۵۶ responsio.

۱۵۷ refluxus maris, aqua multa ; caprificus *arbor*.

۱۵۸ et ۱۵۹ pœnitentia. حَمَنْتُمْ مِنْ مَوْتَنِمْ ante mortem purifices te per pœnitentiam.

۱۶۰ rursus, iterum ; etiam, item ; præterea, quoque. ۱۶۱ مَكَّنْتُ reviruit. ۱۶۲ مَكَّنْتُ adhuc paululum. ۱۶۳ لَمْ يُ non rediit amplius. ... مَكَّنْتُ مَكَّنْتُ aliam agen-di viam nullam invenit nisi...

۱۶۴ rursus, iterum. اَمْهَمْتُ continentia.

۱۵۰ rediens ; pœnitens ; propi-tiator Deus, ar. تَوَابٌ.

۱۵۱ reiteratio, responsio.

۱۵۲, fut. مَكَّنْتُ conspuit, cfr.

neo - ar. شَفَّتْ exspuit, et heb. חִזְבָּה conspureatus a הַזְבָּה .

Ethpe. اَرْتَلْتُ evomitus est.

Pa. اَنْتَ ut usit. seq.

Aph. آتَحَ vomuit.

۱۵۳ saliva ; sputum, vomitus, exspuitio pituitæ.

۱۵۴ et ۱۵۵ id.

۱۵۶, al. ۱۵۷, grando te-nuis.

۱۵۸ vexatio, v. s. ۱۵۹.

۱۵۹ vilis, contemptibilis.

۱۶۰, v. s. مُؤْمِنْ.

۱۶۱, pers. - ar. شُورَدِي , erysi-mum *planta*, petroselinum.

۱۶۲, fut. مَكَّنْتُ admiratus est, stupuit, obstupuit ; con-turbatus est, ar. شَفَّتْ .

Pa. مَكَّنْتُ ut usitat. Aph.

Ethpe. مَكَّنْتُ in admirationem raptus est, stupefactus est ; conturbatus est.

Aph. مَكَّنْتُ in admirationem rapuit, stupefecit ; excitavit.

Part. pass. مَكَّنْتُ .

۱۶۳, ۱۶۴ et ۱۶۵ stupor ; perturbatio, terror.

- مُنْوَدَّ** nomen accentus admirationem exprimens.
- إِنْتَهَىٰ** stupefactio.
- أَوْلَ**, heb. חַזָּה , vastitas, inanitas; interj. حَذْهَعًا أَوْلَ exitium sit mundo ! vae mundo ! it. agedum, macte !
- أَوْلَ**, fut. أَوْلَ saltavit, tri-pudiatus est.
- أَسْلَ** saltatio, chorea.
- مَوْلَ**, fut. مَوْلَ pœnituit eum. Part. præs. مَوْلَ, مَوْلَ, f. emph. مَوْلَ pœnitens.
- Ethpa.** مَوْلَلِ pœnituit illum, c. مَلَ rei.
- Aph.** مَوْلَ pœnitere fecit.
- أَسْمَلَ** pœnitentia, dolor.
- مَلَ**, ar. مَلَ et مَلَ, fut. مَلَ, emollita, flaccida facta est massa etc. ; putruit.
- Pa.** مَلَ emollivit ; sedavit.
- مَلَ**, fut. مَلَ quievit, subsedit ; supersedit a, destitit.
- Pa.** مَلَ sedavit ; repressit, coarctavit, cohibuit.
- Aph.** مَلَ læsit. Part. act. مَهْمَلَ .
- أَنْجَلَ** obex ; septum, caulæ can-
- celli ; pluteus (*gall.* balus-trade, parapet).
- أَنْجَلَ** uter; مَهْمَلَ uter aquarius.
- أَنْجَلَ**, v. s. مَلَ .
- مَكْفَلَ** θυλάκιον, saceulus.
- مَهْمَلَ** sine pl., ar. نَوْمٌ . neo-ar. شُورَمْ , allium.
- مَهْمَلَ**, مَهْمَلَ et مَهْمَلَ ثُبُوكَس , uleus.
- مَهْمَلَ**, pers. شُوقان , decem milia drachmorum.
- مَهْمَلَ** θύμιον, smilax herba.
- مَهْمَلَ** θυμελάχια , enidium planta purgativa.
- مَهْمَلَ** θυμοσάخη , potus ex thymo, aceto et aqua salsa paratus.
- مَهْمَلَ** ثُبُوكَس , thymum : al. sensu, v. مَهْمَلَ .
- مَهْمَلَ** θυμέλη , ara.
- مَلَ**, مَلَ et مَلَ mansio, cubiculum, penetralia ; cellarium : ærarium : thalamus, v. s. مَلَ, ar. مَرْجَى commoratus est.
- مَلَ**, fut. مَلَ minxit.
- مَلَ** et مَلَ f., emph. مَلَ urina.
- مَلَ** et مَلَ id.
- أَنْجَلَ** apertura loricee, vene.
- مَلَ**, v. s. مَلَ .
- مَلَ**, v. s. مَلَ .
- أَنْجَلَ**, v. s. مَلَ .

جَوْلٌ, fut. **جَهَّا** miratus est,
obstupuit.

Pa. **جَوْلٌ** admirationem mo-
vit.

Aph. **جَوْلِي** stuporem excitavit,
in admirationem rapuit.

جَوْلُ admiratio, stupor.

جَوْلَمَّا admirans, attonitus, stu-
pefactus.

جَوْلَمَّا admiratio, stupor.

جَلٌ, ar. **جَلٌ**, fut. **جَهَّا**, excita-
tus fuit; assiluit prae irâ, ir-
ruit.

Aph. **جَلِي** excitavit.

جَلَّا excitatio, impetus.

جَلَّا, pl. **جَلَّا** glandula in
carne, scrofula, ganglion.

جَلَّا ut seq.

جَلَّا excitatio.

جَوْلٌ, **جَوْلَ**, ar. **جَوْلٌ**, taurus;
signum Zodiaci. **جَوْلَ** vitu-
lus. **جَوْلَ** **بَوْلَ** bovine.

جَوْلَ, pl. **جَوْلَ** vacca.

جَوْلَ bovinus.

جَوْلَ **لَبَّا** **لَبَّا**, lupinus.

جَوْلٌ, ar. **جَلَّا**, fut. **جَهَّا**
erravit.

Ethpa. **جَوْلَلِي** erravit, aberra-
vit; moratus est.

جَوْلٌ aberratio, error; locus in-

vius, via in quâ incedens
aberrat, desertum.

جَهَّا et **جَهَّا** per errorem.

جَهَّا falsus.

جَلَّا, ar. **جَرَّتْ**, morus *arbor.*

جَلَّا, v. s. **جَلٌ**.

جَلَّا et **جَلَّا**, v. s. **جَلٌ**.

جَلَّا ut **جَلَّا**, pers.-ar. **جَوْلَيَا**,
thutia, spodium, antimon.

جَلَّا v. s. **جَلَّا**.

جَلٌ, fut. **جَهَّا** ebullivit *olla*;
trop. ferbuit, æstuavit; pro-
tervus, superbus fuit.

Ethpe. **جَلَّا** **جَلَّا** inflammatus est.

Pa. **جَلٌ** id. q. seq.

Aph. **جَلٌ** ebullire fecit, æstuare
fecit.

Ethpa. **جَلَّا** superbivit; exul-
tavit.

جَلَّا ebulliens, æstuans; pro-
tervus, rebellis, furens.

جَلَّا superbe.

جَلَّا ebullitio, æstus; pro-
tervitas.

جَلٌ, fut. **جَهَّا** descendit.

Ethpa. **جَلَّا** demissus est.

جَلَّا anhelatio, suspiratio, sus-
piria.

جَلٌ vapor.

جَلٌ, fut. **جَهَّا** relaxa-

۱۶۱ ab infra. سَكَنْتُ ex infra. سَكَنْدُو infra se.

سَكَنْتَرا sub caelo. سَكَنْدَلُ eodem tempore fuerunt. حَمْدَةٌ deorsum versus; *praeceps.*, inferior, terrenus. لِبَنْ سَكَنْدَلُ rebus terrenis mortuus.

سَكَنْدَلُ, سَكَنْدَلُ inferior, inferus; pars inferior *domus etc.*

سَكَنْدَلُ وَهُوَأْ سَكَنْدَلُ pars ollae inferior. دَكْنَتْ مَنْ سَكَنْتَهُ حُجَّ وَنَفَقَ *dives omnia luero postponens*; *gramm.* nomen accentus *ad divisionem phrasis pertinentis*; *in pl.* سَكَنْدَلُ inferi homines, *oppos.* *ad* سَكَنْتَ superi, cœlites.

Pali سَكَنْدَلُ, *fut.* سَكَنْدَلُ *v. denom.*, demisit, submisit; descendere fecit, humiliavit, subjicit. *Part. pass.* سَكَنْدَلُ demissus, submissus, inferior.

Ethpali سَكَنْدَلِي pass. et refl.; سَكَنْدَلِي se abjecit ad furandum; سَكَنْدَلِي لَا مَكْنَفَنْدَلِي non potuit ad credendum adduci.

سَكَنْدَلِي demissio, inferioritas. سَكَنْدَلِي demissio; humilitas.

سَكَنْدَلِي et سَكَنْدَلِي fæx, impuritas.

Pa. سَكَنْدَلِي *v. denom.*, turbidum

reddidit; contaminavit; turbavit.

سَكَنْدَلِي et سَكَنْدَلِي turbidus, impurus.

سَكَنْدَلِي et سَكَنْدَلِي impuritas.

سَكَنْدَلِي et سَكَنْدَلِي impurus.

سَكَنْدَلِي et سَكَنْدَلِي impuritas, sordes.

سَكَنْدَلِي شُبَرْخ, incensum.

سَكَنْدَلِي شُبَرْخ, sulphur.

سَكَنْدَلِي, v. *supra* سَكَنْدَلِي.

سَكَنْدَلِي f., australis regio, v. سَكَنْدَلِي.

سَكَنْدَلِي, سَكَنْدَلِي et سَكَنْدَلِي ثِيَخَنَى, theca; *per extens.*, vagina *gladii*; sepulcrum.

سَكَنْدَلِي ثِيَخَنَى, fera; præda; *in pl.* littus maris.

سَكَنْدَلِي ثِيَخَنَى, theriaca, antidotum.

سَكَنْدَلِي ثِيَخَنَى, lupinus *planta*.

سَكَنْدَلِي, ar. شَيْس, hircus, caper.

سَكَنْدَلِي tragelaphus *seu cervi species.*

سَكَنْدَلِي, *fut.* سَكَنْدَلِي institut; frequenter, continuo venit, properavit, acceleravit; ursit, pressit, invasit; molestavit, oppressit, afflixit; ingruit *malum*, c. سَكَنْدَلِي pers. *Part. act.* سَكَنْدَلِي, اَدْحَمَ سَكَنْدَلِي tonitrua

atque fulgura se vicissim excipiebant. **שְׂמֵחַתּוֹ וּפְנֵהָ אַמְחָ** invadunt me cogitationes malæ. *Part. præt.* **אַמְחָתּ**; velox, urgens, instans, continuus; durus, gravis.

Ethpe. **אַמְתָּהִתּ** *pass.* ; *it.* institut.

Pa. **אַמְתָּהִתּ** ursit, commovit; vexavit, oppressit; punivit. **אַמְתָּהִתּ לְאַמְתָּהִתּ** instanter dicebat.

Aph. **אַמְתָּהִתּ** pressit, aggravavit, oppressit.

אַמְתָּהִתּ et אַמְתָּהִתּ לְאַמְתָּהִתּ instantia, acceleratio; commotio; continua-

tas.

אַמְתָּהִתּ instanter, continuo.

אַמְתָּהִתּ, arm. **արքաւոր**, ar. **شَفَّور**, titulus regum Armenorum.

אַמְתָּהִתּ 2^a pers. fut. v. **אַמְתָּהִתּ**.

אַמְתָּהִתּ, fut. **אַמְתָּהִתּ** læsit, vexavit, oppressit, cfr. **אַלְיָהִתּ**; *it.* puduit.

Aph. **אַלְיָהִתּ** jacturam fecit, frustratus est; passus est *damnum*.

אַמְתָּהִתּ damnum, jactura; usura; perfidia.

אַמְתָּהִתּ, emph. **אַמְתָּהִתּ**, pl. **אַמְתָּהִתּ** fasciæ, pinnæ; *it.* ligamen femorium, ar. **جَنْكَةٌ**.

אַמְתָּהִתּ, ar. **رَكْل**, commisit rem et in forma VII deriv. **אַמְתָּהִתּ** confisus est, fut. **אַמְתָּהִתּ**, confisus est, fidem habuit *ali-cui*, c. **אַמְתָּהִתּ pers.** *Part. præt.* **אַמְתָּהִתּ**; confidens; arrogans.

Ethpe. **אַמְתָּהִתּ ut Pe.**

Aph. **אַמְתָּהִתּ** confidere fecit, animum addidit, c. acc. pers.; **אַמְתָּהִתּ נְעַמְתָּהִתּ** **אַמְתָּהִתּ** se dedidit omnibus voluptatibus. **אַמְתָּהִתּ אַמְתָּהִתּ et אַמְתָּהִתּ** **אַמְתָּהִתּ** confiden-

tia.

אַמְתָּהִתּ confidenter, tuto.

אַמְתָּהִתּ fiducia, spes certa; promissio, res promissa. **אַמְתָּהִתּ** refugium.

אַמְתָּהִתּ confidentia.

אַמְתָּהִתּ, ar. **نَكْل**, orbitas, status matris filii suis orbatae; *it.*, **אַמְתָּהִתּ**, fiducia, spes certa.

אַמְתָּהִתּ color purpureus, coeruleus *vel* violaceus, heb. **תְּכִלָּה**; *it.* fimbria, pl. **אַמְתָּהִתּ**.

אַמְתָּהִתּ, fut. **אַמְתָּהִתּ et אַמְתָּהִתּ** cohibuit, coereuit; impedivit, c. **אַמְתָּהִתּ**; reprehendit; **אַמְתָּהִתּ** **אַמְתָּהִתּ** cohibe gemitus tuos; intr. riguit manus. *Part. act.* **אַמְתָּהִתּ**; apud gramm., moderator, nomen accentus.

Ethpe. اُدھے pass.

Pa. اُدھے arguit, culpavit, obstructavit; impedivit.

Ethpa. اُدھے objurgatus est.

اُدھمہ reprehensio, culpatio

اُدھمہ cohibens, coercitor.

اُدھمہ coercitio.

اُدھمہ reprehensor, culpator.

اُدھمہ , v. s. .

اُدھمہ mugivit *camelus*.

اُدھمہ , f. اُدھمہ turbatus, perturbatus, *cfr.* دھمہ .

اُدھمہ perturbatio.

اُل , heb. نَهَر , fut. نَهَى suspedit ; elevavit, sustulit ; admovit, addidit ; intendit, direxit ; *intrans.* intentus fuit, studuit, *c. حَتَّى* ; اُل sustulit oculos, suspexit ; اُل spe suspensum tenuit eum ; *it, ar.* لَعْنَى , prælegit. *Part. pass.* اُل , اُدھمہ ; inhærens ; *f. emph.* اُدھمہ ; elata voce recitata *oratio*, *oppos.* ad اُل secreta *oratio*.

Ethpe. اُدھے suspensus est ; adhæsit, studuit *rei*.

Pa. اُدھے suspendit.

Ethpa. اُدھے suspensus est ; adhæsit.

Aph. اُدھے suspendere, adhædere fecit.

اُدھمہ suspensio, suspendium ; pediculus ; تھجھے اُدھمہ inaures.

اُدھمہ suspendum, ansa.

اُدھمہ viscera principalia sibi met adhærentia, ut pulmones, cor, hepar, *id. q. ar.* الْمَفْلَاق .

اُدھمہ vim habens trahendi. شَدَّةٌ اُدھمہ vis attractiva.

اُدھمہ , ut اُدھمہ , mare.

اُدھمہ , ar. نَيْنَى a rad. نَيْنَى quidquid aceto maceratur, acetaria.

اُدھمہ colloquium.

اُدھمہ , v. حَمْدَة .

اُدھمہ , ar. نَيْنَى , nix.

Pa. اُدھمہ v. *denom.*, niveum, candidum reddit ; refrigeravit. *Part. pass.* اُدھمہ .

Ethpa. اُدھے niveus, candidus factus est.

Aph. اُدھے niveum, candidum reddidit ; *it.* albus ut nix factus est.

اُدھمہ uleus e frigore erumpens ; articulorum dolor (*gall. goutte*).

اُدھمہ , fut. اُدھمہ scidit vestes etc., disruptus, dilacera-

vit ; diruit, *cfr. talm.* תְּדִין et ar. تَدَنَّ et تَدَنَّ id. ; *intrans.*, *fut.* تَدَنَّ dirutus est.

Pa. تَكْسَى discerpsit, dilaceravit, penitus diruit.

Ethpa. تَكْسَى pass. et refl.

Aph. تَكْسَى scidit, perrupit.

أَخْسَرٌ et تَكْسَى fissura, ruptura, rima ; hernia ; fauces ; *trop.* stuprum.

أَخْسَرٌ hernia.

أَكْمَمْهُ تَلَبِّيَّةٌ, ut seq.

أَكْمَمْهُ تَلَبِّيَّةٌ et تَكْمَمْهُ تَلَبِّيَّةٌ compressio, oppressio, angustiae.

أَلْلَامْ, inus. ; *cfr. لَلْ*, et ar. لَلْ, leviter terram humectavit ros.

Pa. أَلْلَامْ humidum, uvidum reddidit.

Ethpa. أَلْلَامْ pass.

أَلْلَامْ humidus, uvidus.

أَلْلَامْ humor, humectatio.

أَلْلَامْ palpebra, cilia.

أَلْلَامْ, أَلْلَامْ, أَلْلَامْ, nnq. أَلْلَامْ, ar. أَلْلَامْ, pl. أَلْلَامْ collis, locus editus, tumulus.

أَلْلَامْ, pl. أَلْلَامْ id. ; turris ad orationem Moslemorum indicandam inserviens (*gall.* minaret). أَلْلَامْ, أَلْلَامْ rel. أَلْلَامْ turris carnis ; elephas.

أَكْمَدْتَهُ, pl. أَكْمَدْتَهُ et أَكْمَدْتَهُ, pl. أَكْمَدْتَهُ dimin., parvus collis.

أَكْمَهُ urceolus ore angustus ; tremor lactis, *cfr.* θηρίους succus.

أَكْمَهُ et deriv., v. s. حَمْ.

أَكْمَهُ — *Pa.* أَكْمَهُ irrigit, c. ۵, pers.

أَكْمَهُ ludibrium, irrigatio ; it. بَلَبَّيَّةٌ, lutum.

أَكْمَهُ أَكْمَهُ تَلَبِّيَّةٌ, sacculus, *cfr.* ar. لَلَّامْ id.

أَلْلَامْ, f., pl. أَلْلَامْ vermis, bombyx, assyr. a rad. حَلَّلَ edit, voravit.

أَلْلَامْ nom. unit. id. ; purpura.

أَكْفَارُ, pl. أَكْفَارُ palpebra.

أَلْلَامْ, v. s. أَلْلَامْ.

أَكْفَعُ, fut. أَكْفَعُ loco dimovit, evulsit, disrupt.

Ethpe. أَلْلَامْ pass.

أَكْفَعُ et أَكْفَعُ evulsio.

أَلْلَامْ, c. fem. nom. usurpat., st. emph. أَلْلَامْ c. masc. usurpat., heb. תְּלִשְׁׂשָׁה, תְּלִשְׁׂשָׁה, ar. تَلَاثَةٌ, tres, tria ; c. ؟, أَلْلَامْ tertius, أَلْلَامْ tertia, c. suff. قَوْنَتَهُ أَلْلَامْ tres illi ; أَلْلَامْ

٣٣٣ tribus vicibus; *adj. c.* : :
 ٣٣٤ funiculus triplex;
subst. ٣٣٥ id. *q.* ٣٣٦
 ٣٣٧ dies tertia hebdomadis;
 ٣٣٨ feria tertia. ٣٣٩
 tredecim, ٣٤٠ et
 ٣٤١ f., *id.* ٣٤٢ ٣٤٣
 ٣٤٤ trecenti, trecenta. ٣٤٥
 tria millia.

Pa. ٣٤٦ v. *denom.*, ad numerum tertium auxit, tripli-
 cavit. *Part. pass.* ٣٤٧ ;
 triangularis.

٣٤٨ triginta.

٣٤٩ tertia pars; *it.* ٣٥٠
 trinus, tres annos natus.

٣٥١ triennis; *it.* *nnq.* trinus,
ar. ثُلث.

٣٥٢ tertius; triduanus *Chris-*
tus in sepulchro; trinus;
 triplex, tribus partibus con-
 stans; ٣٥٣ ٣٥٤ ter bea-
 tus; ٣٥٥ ٣٥٦ triplici no-
 mine præditus; *ap. gramm.*,
 ٣٥٧ ٣٥٨ ٣٥٩ verba tri-
 littera. ٣٦٠ ٣٦١ triparti-
 tum *opus*; *it. subst.* mediator
 (*gall. tieris*).

٣٦٢ trias; sanctissima
 Trinitas; *in st. c.* ٣٦٣
 adverb. *ut seq.*

٣٦٤ ter, tertio, triplici mo-
 do. ٣٦٥ ٣٦٦ ter miseri.

٣٦٧ trigesimus.

٣٦٨ numerus tricenarius.

٣٦٩ , *fut.* ٣٧٠ admir-
 atus est, stupuit, *c.* ٣٧١
 vel ٣٧٢ pers. aut rei. *Part.*
præt. ٣٧٣ ; attonitus; mira-
 bilis, stupendus.

Ethpe. ٣٧٤ id.

Pa. ٣٧٥ in admirationem ra-
 puit.

Ethpa. ٣٧٦ pass.; *it.* miratus
 est.

Aph. ٣٧٧ in stuporem conje-
 cit.

٣٧٨ admiratio, stupor.

٣٧٩ ٣٨٠ admirabiliter.

٣٨١ ٣٨٢ stupor; prodigium;
 stupor *oculi seu morbus quo*
oculi aperti et fixi manent.
 ٣٨٣ ٣٨٤ , *ar.* شُورَى , mensis
 Julio fere respondens; *it.*
 Mars *planeta*.

٣٨٥ mensuram ad *legis nor-*
mam complevit.

٣٨٦ ٣٨٧ , *it. c.* Aleph pros-
 thet. ٣٨٨ ٣٨٩ , *heb.*
 תְּבוֹל , אַחֲרָוֹל , heri.

٣٩٠ ٣٩١ , *contr. ex* ٣٩٢ *et* ٣٩٣ ,
 nudius tertius.

٣٩٤ ٣٩٥ ٣٩٦ , ara.

٣٩٧ , *inus. in Pe.*, *cfr.* ٣٩٨

- heb.* حَسْنٌ *et ar.* حَسْنٌ, perfectus, absolutus est.
- Pa.* حَسْلٌ absolvit, perfecit; justificavit.
- Ethpa.* حَسْلٌ justus, innocens factus est; probe egit; ingenuitatem simulavit.
- حَسْلٌ integer, probus, justus; mitis.
- حَسْلٌ sine dolo.
- حَسْلٌ integritas, perfectio; simplicitas, mansuetudo, sinceritas.
- حَسْلٌ, *v. s.* حَسْلٌ.
- Palpel* حَسْلٌ, *ar.* حَسْلٌ, balbutivit, mussitavit, susurravit inter dentes *magus*.
- حَسْلٌ mussitans.
- حَسْلٌ balbuties.
- حَسْلٌ**, *nnq.* حَسْلٌ, *ar.* حَسْلٌ, ibi, illic, *oppos. ad* حَسْلٌ *hic*.
حَسْلٌ illuc. حَسْلٌ quo, ad quem locum. حَسْلٌ ... حَسْلٌ ... inde, exinde ... حَسْلٌ ubi ... ibi ...
حَسْلٌ, *ex lō c. epenthet.*; et حَسْلٌ, illic, ibidem.
- حَسْلٌ**, *nnq.* حَسْلٌ, *c. f. usurp.*, *emph.* حَسْلٌ *c. m. usurp.*, *heb.* حَسْلٌ, *ar.* حَسْلٌ, octo; *adj.*
- حَسْلٌ, *c. ?*, حَسْلٌ octavus, حَسْلٌ octava; *c. suff.* حَسْلٌ etc., *subst.* حَسْلٌ, *c. ؟* usurp. octava dies mensis: حَسْلٌ, et *sæpius* حَسْلٌ octodecim, *c. masc.*, حَسْلٌ et حَسْلٌ *id. c. fem. nom.*; حَسْلٌ octingenti, *m. et f.*
- Pa.* حَسْلٌ *v. denom.*, octogonum, octuplicem fecit.
- حَسْلٌ octava pars; obolus, quadrans.
- حَسْلٌ, *f. emph.* حَسْلٌ octavus; حَسْلٌ octangulus.
- حَسْلٌ numerus octavus.
- حَسْلٌ et حَسْلٌ octoginta.
- حَسْلٌ octagesimus.
- حَسْلٌ numerus octogenarius.
- حَسْلٌ θύμυνος, virgultum.
- حَسْلٌ, *v.* حَسْلٌ.
- حَسْلٌ, *ar.* حَسْلٌ, crocodilus.
- حَسْلٌ, *ar.* حَسْلٌ, *fut.* حَسْلٌ siccativit carnem minutatim concisam. *Part. pass.* حَسْلٌ; *subst.* caro minutatim concisa.
- حَسْلٌ coll., حَسْلٌ, daetyli. حَسْلٌ tamarindi. حَسْلٌ phœnix.
- حَسْلٌ *nom. unit.*, daetylus.
- حَسْلٌ qui daetylos vendit, daetylorum mereator.

أَمْنَى, pl. أَمْنَى palpebra ; cfr. شَرَّ obtexit.
أَمْنَى, v. s. أَمْنَى.

أَمْنَى, cfr. ar. أَتَى iteratus est et أَتَى iteravit; laudavit, fut. أَتَى iteravit; recitavit, narravit, descripsit; præc. vel seq. al. verbo æquiv. adv. iterum, rursus. أَتَى وَقَدْ مُهْنَدْ مُهْنَدْ agriculta qui iterum arat, pulchram messem colligit. Part. act. أَمْنَى, أَمْنَى; f. emph. أَمْنَى, subst. pl. أَمْنَى ansa chlamydis etc. (gall. boutonnière). Part. pass. أَمْنَى, أَمْنَى.

Ethpe. أَمْنَى pass.

Pa. أَمْنَى pluries iteravit; recitavit, narravit; confabulatus est, c. مُهْنَدْ.

Ethpa. أَمْنَى recitatus est, narratus est.

Pali أَمْنَى, cfr. heb. הַנְהָה, pacatus est, stipulatus est.

Ethpali أَمْنَى pass.

أَمْنَى iteratio, repetitio; narratio; أَمْنَى iteratio manus : retributio duplex; castigatio itera- ta; adv. أَمْنَى et أَمْنَى مُهْنَدْ iterum. أَمْنَى duplex.

أَمْنَى ap. gramm., exceptio, id. q. ar. إِسْتِشَنَّا.

أَسْتِرْ iteratio, repetitio; commemo- ratio. أَسْتِرْ تَعْدِيدْ Deuteronomium; it. adj. f. emph. أَسْتِرْ secundus; duplex, al. أَسْتِرْ; it. duos annos natus agnus etc.

أَسْتِرْ iteratio; adverb. in st. cst. أَسْتِرْ secunda vice, iterum. أَسْتِرْ, ap. gramm., exclusivus. أَسْتِرْ f., talm. הנְאֵר, contrac- tus, pactum, conditio.

أَسْتِرْ narratio, nuntius. أَسْتِرْ بُكْلَهْ nuntius falsus; أَسْتِرْ مُهْنَفْ et abs. fabulae; ap. gramm. ut seq.

أَسْتِرْ narrans; historiographus; ap. gramm. أَسْتِرْ مَدْسِنْ modus narrativus (præt. et fut. per oppos. ad imper.) أَسْتِرْ مَدْسِنْ iterato, iterum.

أَسْتِرْ, fut. نَهْدَتْ torpuit membrum, sensus.

Aph. أَسْتِرْ effecit ut torperet membrum.

أَسْتِرْ torpor manus ex fri- goris excessu.

أَسْتِرْ torpens membrum.

أَسْتِرْ lues, fames.

أَسْتِرْ et أَسْتِرْ grana nucleis cerasinis similia (ar. مَحَاجَب). أَسْتِرْ monetæ species apud Persas.

فُلِيْجَةُ fuligo.
 اسْنَدَا etc., v. s. اس .
 اسْنَدَهُمْا , ar. شُورَمْ , cannabis plan-
 ta.
 اسْنَدَهُمْا fornax, heb. חָנוֹר , cfr.
 اسْنَدَهُمْا وَقْتَهُمْا ignis ; اسْنَدَهُمْا can-
 delabrum ; it. thorax, lorica,
 pers. شُورَهْ .
 اسْنَدَهُمْا furnus.
 اسْنَدَهُمْا , fut. اسْنَدَهُمْا fumavit, suffivit.
 Pa. اسْنَدَهُمْا fumigavit, fumum
 emittere fecit ; fumum emisit.
 Ethpa. اسْنَدَهُمْا fumigatus est ;
 fumum emisit.
 اسْنَدَهُمْا et اسْنَدَهُمْا fumus.
 اسْنَدَهُمْا fumosus.
 اسْنَدَهُمْا draco, cfr. heb. חֶנְדָּה , ar.
 شَيْنَ ; cete grandia ; it. apud
 Alchim., nomen ollæ.
 اسْنَدَهُمْا hic, ibi.
 اسْنَدَهُمْا calamitas, ejulatus, dolor.
 اسْنَدَهُمْا , id. q. اسْنَدَهُمْا .
 اسْنَدَهُمْا et اسْنَدَهُمْا auri ferrumen,
 pers.-ar. شَكَرْ , chrysocolla.
 اسْنَدَهُمْا , vide s. مُكْبَرْ .
 اسْنَدَهُمْا etc., v. s. مُكْبَرْ .
 اسْنَدَهُمْا etc., v. s. حَبَّةٌ .
 اسْنَدَهُمْا , f. شَعَالَةٌ et شَعَالَةٌ , ar. شَعَالَةٌ vul-
 pis : solanum planta.

Pa. اسْنَدَهُمْا v. denom., vulpis mo-
 re versute egit, vafer fuit.
 اسْنَدَهُمْا astutia vulpina ; in pl.
 اسْنَدَهُمْا alopecia, seu morbus
 vulpinus.
 اسْنَدَهُمْا , ar. تَعْسَى , miser fuit,
 fut. اسْنَدَهُمْا ; laboravit,
 fatigatus est ; trans. fatiga-
 vit, molestavit ; it. ut اسْنَدَهُمْا ,
 titubavit, lapsus est. Part.
 præt. pass. اسْنَدَهُمْا ; laborans,
 sollicitus ; asper, durus, mo-
 lestus ; miser ; pl. f. اسْنَدَهُمْا
 ærumnæ.
 Aph. اسْنَدَهُمْا laborare fecit,
 vexavit.
 اسْنَدَهُمْا et اسْنَدَهُمْا fatigatio, labor,
 ærumna.
 اسْنَدَهُمْا defatigatio, labor,
 ærumna. حَدَّمَهُمْا وَلَا حَمَّلَهُمْا
 stulto labore.
 اسْنَدَهُمْا , v. s. حَمَّلْ .
 اسْنَدَهُمْا , fut. مُكْبَرْ fulcivit ollam
 tripode.
 اسْنَدَهُمْا vel اسْنَدَهُمْا , ar. شَفَّيَةٌ tripus
 ollæ, lapides quibus olla im-
 ponitur ; focus, elibanus ; co-
 quina, pl. اسْنَدَهُمْا ; اسْنَدَهُمْا
 chytropus ; coquina. اسْنَدَهُمْا
 ardor febris.
 اسْنَدَهُمْا , v. s. اسْنَدَهُمْا .

۷۰۱, heb. תְּלִין, phylacteria seu membranae papyraceæ in quibus verba legis continebantur et fronti appendebantur.

۷۰۲ fimbriæ vestium.

۷۰۳ et ۷۰۴, v. s. **۷۰۵**.

۷۰۶ v. ۷۰۷.

۷۰۸ rivus, ar, نهر; aqueductus, canalis.

۷۰۹ v. denom., effluere fecit aquas.

۷۱۰ Ethpa. **۷۱۱** diffusa est aqua, defluit.

۷۱۲ Pali **۷۱۳ id. q. Pa.**

۷۱۴ fut. **۷۱۵** **۷۱۶** pugno cecidit.

۷۱۷ sceptrum; baculus pastoralis episcoporum (*gall.* crosse).

۷۱۸, heb. נְשָׁשׁ, fut. **۷۱۹** appendit argentum in statera, ponderavit; per extens., numeravit, solvit alicui pecuniam; trop. fixit, stabilivit Deus molem mundi; intrans., pondus habuit, ar. نهر. **Part.**

۷۲۰ act. **۷۲۱**, **۷۲۲**; **۷۲۳** مل.

۷۲۴ **۷۲۵** Deus pro laboribus affectum mu-

neratur. **Part. pass.** **۷۲۶**, **۷۲۷**; ponderosus, gravis; **۷۲۸** كَهْمَلْ كَهْمَلْ gravis est ejus dolor pro ratione amoris ejus. **۷۲۹** حَمَلْ حَمَلْ vitam inter et mortem suspensi.

Ethpe. **۷۳۰** **۷۳۱** pass., it. offendit pedem, impegit. **۷۳۲** حَكَمْ حَكَمْ si quis nocte ambulaverit, offendit.

۷۳۳ Pa. **۷۳۴** ponderavit; it. corruere fecit.

Ethpa. **۷۳۵** pedem offendit, impegit; aggravatus est.

Aph. **۷۳۶** pondus habuit; offendit.

۷۳۷, ar. نهر, onus.

۷۳۸ **۷۳۹** ponderatio, pondus; pondus viginti drachmarum.

۷۴۰ **۷۴۱** pondus.

۷۴۲, pl. **۷۴۳** **۷۴۴** pensio; onus, vectigal.

۷۴۵ pensor (*gall.* peseur public).

۷۴۶, emph. **۷۴۷** offendiculum, scandalum, pl. **۷۴۸** **۷۴۹**.

۷۵۰ onus.

۷۵۱ ponderatio, pensio; offendiculum, lapis scandali.

۷۵۲, pl. **۷۵۳** **۷۵۴** pondus ad ponderandum, libra, pondo.

مَدْعُولٌ *id.*; *siclus*, moneta aurea, *heb.* מְדֻעָה, *ar.* مِثْقَالٌ; *per extens.*, præmium, merces; *regula*. حَكْمَتُنَا وَمَدْعُولُنَا لِسْبَرٌ linguae constituatur norma. مَدْعُوكٌ ad pondus pertinens.

مَصَّا, *fut.* نَهَفَ constituit, firmus stetit, stabilitus est; rediit sanus, convaluit.

Pa. مَفَّلٌ statuit, condidit, firmavit, stabilivit; instituit, disposuit, ordinavit, instruxit, instauravit, reparavit; *trop.* affirmavit. *Part. pass.* مَهَّدَهُ, مَهَّمَنَا ordinatus, dispositus.

Ethpa. مَهَّلَلٌ *pass.*; مَهَّلَلٌ homo uti cœlestis *creatura* formatus est. *Part. pass.* مَهَّمَهُ, مَهَّمَنَا; مَهَّمَنَا, مَهَّمَنَا sedes judicis apparata est; حَوْلًا لَا مَهَّمَهُ أَيْضًا مَهَّمَهُ veritas aliter ac fabula constituta est, *seu* aliam nataram habet.

Aph. مَفَّلٌ, *ar.* أَثْقَنَ statuit, condidit; disposuit, ordinavit. مَدْخَلٌ eum regem creavit. *Part. pass.* مَهَّدَهُ, مَهَّمَنَا; *subst.* basis, fundementum; stabilitas, ordo. مَهَّنَا, *f. emph.* مَهَّنَا, *ap. Occid.*

أَمْدَهَا, constans, firmus, stabilis; *trop.* rectus, probus, pius; laudabilis; *subst.* أَمْدَهَا planities montis *seu* jugum montis (*gall.* plateau); *it.* subst. *in pl. f.* أَمْتَهَا dotes, qualitates, merita.

أَمْنَهَا recte, directe, firmiter; attente.

أَمْنَهَا rectitudo, firmitas; ordo.

أَمْنَهَا institutio, creatio; reparatio, reformatio; præparatio, chimica præparatio; ars, artificium, opus; apparatus *cœnæ*, ipsum convivium, obsonium; *it.* planities; lumen molle.

أَمْنَهَا, أَمْنَهَا firmus, bene constitutus; institutus, ordinatus; prudens.

أَمْنَهَا rectitudo, firmitas; ordo.

أَمْنَهَا correctio.

أَمْنَهَا ordinator, dispositor.

أَمْنَهَا ordinatio, reparatio; status, conditio.

مَهَّـ, *fut.* مَهَّـ robustus fuit, invaluit, prævaluuit.

Pa. مَهَّـ corroboravit, confirmavit.

Ethpa. مَهَّـ corroboratus, confirmatus fuit; *c. al. sensu* vide مَهَّـ.

مَهْمَلٌ, **مَهْمَلَهُ** robur, vires; potentia, virtus.

مَهْمَلٌ corroboratio; vis, robur.

مَهْمَلٌ validus; potens, vehemens; c. مَهْمَلٌ, robustior, validior.

مَهْمَلٌ, **مَهْمَلَهُ** fortitudo, vis.

مَهْمَلٌ valide, fortiter, vehementer, acriter.

مَهْمَلٌ, *forma contract. vocis* مَهْمَلٌ *præpos. usurpat.*, prope, apud; *it. subst., pers., nomen avis.*

مَهْمَلٌ, *nng. مَهْمَلٌ*, *pl. مَهْمَلٌ* educator, paedagogus, præceptor; *cfr. θεωρία* speculatio, contemplatio.

Pa. مَهْمَلٌ *et* مَهْمَلٌ *v. denom.*, docuit, erudit, educavit.

Ethpa. مَهْمَلٌ *et* مَهْمَلٌ *pass.*

مَهْمَلٌ disciplina, educatio.

مَهْمَلٌ, *f.* مَهْمَلٌ *educator, præceptor.*

مَهْمَلٌ *educatio.*

مَهْمَلٌ, *usitat.* تَرْيِيْفٌ, *ar. تَرْيِيْفٌ*, *fut.* مَهْمَلٌ emollitus, madefactus est, maduit; dissolutus est. *Part. præt.* مَهْمَلٌ, مَهْمَلٌ.

Pa. تَرْيِيْفٌ humectavit, maceravit.

Ethpa. تَرْيِيْفٌ *pass.*

Aph. تَرْيِيْفٌ emollivit, madefecit, humectavit, liquefecit, mace-ravit, macerandum curavit. تَرْيِيْفٌ emollitio, maceratio, dis-solutio.

تَرْيِيْفٌ maceratum quodlibet con-ditum; succus ex uvis passis expressus.

تَرْيِيْفٌ, *ar. تَرْيِيْفٌ*, Pleiades con-stellatio.

تَرْيِيْفٌ θρασκίας, ventus septentrionalis a Thracia spi-rans.

تَرْيِيْفٌ, **تَرْيِيْفٌ** θρακίας, seu λίθος θρακίας, lapis Thraciæ quem in aqua ardere et in oleo extingui perhibebant.

تَرْيِيْفٌ, **تَرْيِيْفٌ** pinguedo; pulpa, medulla, *ar. تَرْبَةٌ*.

تَرْيِيْفٌ pinguis.

Aph. تَرْيِيْفٌ *v. denom.*, pinguis fuit vel factus est.

تَرْيِيْفٌ, *vox pers.*, tunica.

تَرْيِيْفٌ, *ar. تَرْجِمَةٌ*, interpre-tatus est; *ex una in aliam linguam transtulit*; exposuit, explicuit, *c. acc.* *vel* حَدَّ rei; allocutus est *populum* *c. vel* حَدَّ *pers.*, concionatus est, collocutus est, admonuit, *c. حَدَّ pers.* *et* حَدَّ rei.

duodecim Apostolorum; *c. suff.*
 اَوْدَعْتَنَا ، اَوْدَعْتَنَا ; *c. د* ،
 die duodecima *mensis*.
 اَوْمَنْتَا ، *raro اَسْنَتْا* , *f.* secundus ; duplex. اَوْمَنْتَا
بِمَنْخَرٍ *secundus post regem :*
subregulus (gall. vice-roi).
 اَوْمَنْتَا bilingues,
 duplices corde. اَوْمَنْتَ تَعْمَلُ *hy-*
pocritæ. اَوْمَنْتَ وَتَلَّا bipedes.
 اَوْمَنْتَا *ipsis im-*
probis me postposuerunt.
 اَوْمَنْتَا بِمَهْلَةٍ اَنْتَمْ كَمْ اَوْمَنْتَا
Episcopi qui has
secundas sedes tenent ; ap.
gramm. اَلْكَلِي اَوْمَنْتَا مَتَلَّا *ver-*
ba bilittera (uti دَى ، نَعْ ، حَى ، حَى).
 اَوْمَنْتَا dupli modo, bifariam.
 اَوْمَنْتَا dualitas ; duplicitas.
 اَوْمَنْتَا اَوْمَنْتَا وَمَنْهَدَا *dualitas hypos-*
taseon. اَوْمَنْتَا *حُنْتَا* doctrina
duplicis naturæ in Christo.
 اَوْمَنْتَا et اَوْمَنْتَا اَوْمَنْتَا
 θεριάκων , ar. ترباق , theria-
 cum , v. اَمْنَمْفَت .
 اَوْمَنْتَا ptisana, cf. قَدْمَنْتَانْ et اَوْسَنْتَانْ .
 اَوْمَنْتَا palea.
 اَوْمَنْتَا et اَوْمَنْتَا inops, pauper.
 اَوْمَنْتَا piger, lentus.
 اَوْمَنْتَا pera (*gall. besace*).
 اَوْمَنْتَا serum *lactis*.
 اَوْمَنْتَا cypressus.
 اَوْمَنْتَا et اَوْمَنْتَا gal-

lus gallinaceus, f. **الْفَوْكَدَا**,
 pl. **الْفَوْكَدَاتِ** gallina.
الْفَوْكَنْجَةُ upupa.
الْفَوْكَنْجَمْهَا et serum lactis ut
الْفَوْنَمْ; it. ferculum e lacte et
 hordeo paratum.
الْفَوْكَسْ, fut. **الْفَوْكَسْتِ** aluit, nutri-
 vit. Part. act. **الْفَوْكَسْمَا**, **الْفَوْكَسْمَهَا**, **الْفَوْكَسْمَهَمَا** ;
الْفَوْكَسْمَهَمَهَا omnium nutritio-
 res. **الْفَوْكَسْمَهَمَهَمَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** luera quæ nutriunt
 concupiscentiam carnalem.
 Ethpa. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** nutritus est ;
 pastus est. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**
الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا alienis fruitus est la-
 boribus. Part. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**
 vescens aliqua re, c. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**.
الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا, pl. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** alimentum,
 cibus ; pastus. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**, **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**
 nutravit, cibavit. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**
الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا boni mores alunt seie
 servant vitam christianam.
الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا et **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**, pl. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**
 id. ; **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** atrophia oculi.
الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** nutriens. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**
 eremus cibo carens. **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** vescens ;
الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** de mensa
 spirituali victum sumentes.
الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا et **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا** **الْفَوْكَسْمَهَمَهَمَهَمَهَا**
 religio, timor religiosus.

وَل, fut. **وَلَّ** scidit, disrupt; perfodit, perrupit, aperuit *venam, os*; labefactavit, evertit; *intrans.*, erupit. Part. act. *præs.* **وَلِ**, **وَلْ**; subst. **وَلْ**, f. **وَلْ** ostiarius. Part. pass. *præt.* **وَلْ** rumpens. **وَلْ** مُوْمَدْ لَوْلَوْ لَوْلَوْ hæmorrhagia laborabat.

Ethpe. **وَلَلِ** pass.

Pa. **وَلِ** irrumpere fecit *a-quas*; concidit, discerpst, laceravit; evertit.

Ethpe. **وَلَلِ** pass.

وَلْ scissio, fissio, sectio *venæ*, irruptio. **وَلْ**, ar. شَرْعَةٌ, pl. أَنْوَادْ حَدَّادْ scissura, ruptura, hiatus *muri*, ruina; cataracta (*gall. écluse*); trop. damnum, jactura, سُخْدَانْ حَسْنَهْ أَوْلَادْ حَدَّادْ fissura *seu* aditus *animæ*, amor reficit quassata.

وَلْ, pl. **وَلْ** ostium, porta; aditus; capitulum libri. **أَقْتَلْ** **وَلْ** velum. **أَنْهَى** **وَلْ** aula regia. **حَمْهَى** **وَلْ** **وَلْ** vestibulum, atrium.

وَلْ dim. ostiolum.

وَلْ et **وَلْ**, f. **وَلْ** ostiarius.

وَلْ effractor; direptor. **وَلْ** eruptio; laceratio. **وَلْ** et **وَلْ**, v. s. **وَلْ**. **وَلْ** **وَلْ** hiatus, scissura, ruptura.

وَلْ genus *cucumber*, al. lens, planta aquatica, *id. q.* قَنْدَمْ .

وَلْ etc., v. s. **وَلْ** et s. حَمْ .

وَلْ, fut. **وَلَّ** purificavit; *intrans.* natavit.

Aph. **وَلِ** natare fecit.

وَلْ, heb. תְּרָפִים, Theraphim; simulacra, idola.

وَلْ, fut. **وَلَّ** recte stetit; recta tendit, se direxit; trans. rectum fecit; aptavit, ordinavit, direxit; disposuit; direxit arcum; duxit, adduxit aliquem, c. لَمْ; trop. edocuit, c. **وَ** pers. et **وَ** rei. **وَلْ** أَوْلَادْ كَهْدَبْ contra me viam arripisti: hostiliter me petisti. Part. pass. *præt.* **وَلِ**; rectus, integer; cfr. ar. شَيْصْ, reeta bilanx; **وَلْ** مُهَدْسَهْ orthodoxus, *nnq. abs.* **وَلْ** *id.*

Ethpe. **وَلَلِ** pass. et rest.; se correxit, se emendavit.

Pa. **وَلِ** rectum fecit, recte

VOCABULARIUM

NOMINUM PROPRIORUM

quæ frequentius occurunt apud Syros.



- أَهْلُكَمْهُ Aetius dux.
أَهْلَكَلَّا Ahila urbs Palæstinæ.
أَهْلًا pater, Aba, pr. m.
أَهْلَكَنْ et أَهْلَكَنْ Abgar Edessæ rex, a voce syr. أَهْلَكَنْ claudus, aut Armen. أَهْلَكَنْ quasi أَهْلَكَنْ vir princeps; pl. أَهْلَكَنْ regum Edessenorum nomen.
أَهْلَكَهُ Abdo nomen pr. mase.
أَهْلَكَنْ Abdia pr. m.
أَهْلَكَنْ Eὐδοκία, Eudocia f. mart.
أَهْلَكَنْ et أَهْلَكَنْ Eὐδόξος, Eudoxius mart.
أَهْلَكَمْهُ Ἐβδομά, Hebdomum suburbium Constantinopolis.
أَهْلَكَنْ Ἀβδηρά, Abdera urbs Thraciæ; أَهْلَكَمْهُ Abderitani.

- أَهْلَكَهُ, ar. أبو , pater multis non minibus praefigitur ad cognomina formanda.
أَهْلَكَنْ ar. أَهْلَكَنْ pater consolationis, Abu'lfa ragius, plurimum nomen viro rum illustrium inter quos eminet Gregorius Bar-Hebræus.
أَهْلَكَهُ ar. أبو علي , Abu-Ali cognomen Avicennæ.
أَهْلَكَنْ pater vivens, Abhæus pr. m.
أَهْلَكَنْ pater, hebr. אָבִי , cognomen est multorum virorum; it. Abi mart.
أَهْلَكَنْ S. Abæus.
أَهْلَكَنْ Abia pr. m.
أَهْلَكَنْ Abigaïl uxor Nabal.
أَهْلَكَنْ Abihail pr. m.

أبيود	Abiud pr. m.	أجل	Agel metrop. Armeniae.
إبئون	Ebion heresiarcha ; إبئونتا Ebionita.	قسطنطين	et قسطنطيوس S. Agapius mart.
أبila	Abila urbs Syrie.	أغripa	Agrippa.
أبيلينا	Abilene provincia Syrie.	أدمون	Edom ; ادمون Idumaeus ; أدموناتا gens Idumaea, Idu- mæitas.
أبيملاخ	Abimelech pr. m.	أدريانوس	Oδυσσεύς, Ulysses.
أبيناداب	Abinadab pr. m.	أدربيجان	آدربيجان ar. Adar- bijan provincia in Perside ; أدربيجنا incolæ hujus regionis.
أبيزير	Abiezer pr. m.	أداeus	et أداeus S. Adæus, apostolus <i>Chaldaeorum.</i>
أبيان	Abisan, id. q. سعده He- sebon urbs Palæstine.	آدام	Adamus ; آدم ، آدموس ad Adamum pertinens.
أبيرام	vel أخنة Abiram pr. m.	آدانة	Adana Cilicie urbs.
أبسالون	Absalon f. Davidis.	آدessa	etc. Edessa, urbs Mesopotamiae, v. آدسا ; آدسان Edessenus.
أبياثار	vel أخنة Abiathar.	آدریانوس	et آدریانوس mare Adria- ticum.
آباشان	, pers. آدادا regio Abasgo- rum prope Caucasum.	آرون	Aaron fr. Mosis.
آبراهام	et آبراهام Abraham.	آهيرمان	Ahiraman, pers. آهرمن , idolum Persarum.
آباريم	Abarim mons.	آولانس	Valens imperator.
آباريز	Abares gens Scythica.	آولنتينوس	Valentinus hære- ticus.
آغابوس	Agabus propheta.	آولنتيانوس	Valentinianus.
آگا	et آگا Aegae u. Cilicie.	آېگەن	Eugenius , S. Eugenes seu Augin eremita.
آگاتھو	et آگاتھو Agatho papa.	آۋاغرۇي	Evagrius pr. m.
آکباتانا	Ecbatana n. Medorum.		
آگاپetus	S. Agapetus papa.		
آجاش	، آجاش ، مەھمەت ، مەھمەت et مەھمەت		
آیا	آیا Egyptus provincia.		
آگا	etc., pl. آگا Egyptius.		
آگا	Agag rex Amalec.		
آگوج	ut آگوج , Agog seu Gog populus Scythicus.		
آگوستوس	Augustus.		
آگاچ	Aggaeus Mesopotamiae apostolus.		

- | | | | | |
|--------------|----|--------------------------------------|----------|---|
| وَأَمْهَدْتَ | et | S. Evidius episc. Antiochenus. | وَقَنْتَ | Hyrcania regio. |
| وَأَمْهَدْتَ | et | Eutyches heresiarcha. | وَقَنْتَ | Jerusalem; |
| وَأَمْهَدْتَ | et | secutor Eutychetis. | وَقَنْتَ | Hierosolymitanus. |
| وَأَمْهَدْتَ | et | Niger, cognomen Abgaris. | وَقَنْتَ | Azotus, u. Palæstine. |
| وَأَمْهَدْتَ | et | Pontus Euxinus. | وَقَنْتَ | Achaeus, |
| وَأَمْهَدْتَ | et | Olympus mons. | وَقَنْتَ | pr. pl. virorum. |
| وَأَمْهَدْتَ | et | Homerus. | وَقَنْتَ | frater matris ejus, |
| وَأَمْهَدْتَ | et | Eunomius hæreticus; Εὔνομος ἡ θεατή. | وَقَنْتَ | Achudemeh Maphrianus. |
| وَأَمْهَدْتَ | et | Eusebius pr. plur. virorum. | وَقَنْتَ | Achaz rex. |
| وَأَمْهَدْتَ | et | Eupator rex. | وَقَنْتَ | frater meus, Achi, heb. אֲחִי, pluribus nominibus. |
| وَأَمْهَدْتَ | et | Apamæa urbs | وَقَنْتَ | Achitob sacerdos. |
| وَأَمْهَدْتَ | et | Cœlesyriæ. | وَقَنْتَ | Achimelek f. Achitob. |
| وَأَمْهَدْتَ | et | S. Euthymius. | وَقَنْتَ | Assuerus rex. |
| وَأَمْهَدْتَ | et | Oceanus. | وَقَنْتَ | Attica, Hellas. |
| وَأَمْهَدْتَ | et | Euclides. | وَقَنْتَ | Iberia; pl. Ιβηρία. |
| وَأَمْهَدْتَ | et | Ur, urbs in Chaldaea. | وَقَنْتَ | pl. Ιβηρι, Iberus, Tartarus. |
| وَأَمْهَدْتَ | et | Edessa, v. | وَقَنْتَ | it. Ιβηρία. |
| وَأَمْهَدْتَ | et | Edessenus; Εδέσσης. | وَقَنْتَ | S. Ignatius. |
| وَأَمْهَدْتَ | et | dialectus Edessena. | وَقَنْتَ | Hierapolis. |
| وَأَمْهَدْتَ | et | Europa. | وَقَنْتَ | et Αἰωνία, Αἴωνας, Joan-nes. |
| وَأَمْهَدْتَ | et | Urias pr. m. | وَقَنْتَ | Jobus propheta. |
| وَأَمْهَدْتَ | et | Origenes. | وَقَنْتَ | Joppe u. Palæstine. |
| وَأَمْهَدْتَ | et | Euripides poeta. | وَقَنْتَ | Julianus apostata. |
| وَأَمْهَدْتَ | et | Urmia u. Persidis. | وَقَنْتَ | Jezrael urbs et pr. m. |
| | | | وَقَنْتَ | et Αἰταλία, Italia. |
| | | | وَقَنْتَ | Αἰταρεῖα. |
| | | | وَقَنْتَ | et Αἰλάθη, Αἰλάθη et Αἴλαθη Elath seu Aelana urbs Idumææ. |
| | | | وَقَنْتَ | Αἴλατη, v. Αἴλατη. |
| | | | وَقَنْتَ | Αἴλατη, v. Αἴλατη. |
| | | | وَقَنْتَ | Isauria provincia. |

אַיָּסָאָק Isaac.	אֵלִיָּהוּ Eliu <i>pr. m.</i>
אֶיְשָׂרָאֵל et אֶיְשָׂרָאֵל Israel ; אֶיְשָׂרָאֵלִיתָא Israeltita.	אַיְלֹנְהָפָלִיס Helio-polis <i>urbs.</i>
אַיְפּוֹקְרָטִיס Hippocrates <i>medi-cus.</i>	אַיְלָם Elim <i>prop. loci.</i>
אַיְנוּנִים Iconium <i>urbs.</i>	אַיְנָהָסָקְרָטִיס Græcus ; <i>per extens.</i> paganus.
אַיְנָהָזָר Herodes.	אַיְלָזָר Eleazar ; <i>it.</i> Lazarus.
אַיְנָחִיר Jericho <i>urbs Palæstine.</i>	אַיְלָפָח Eliphaz <i>pr. m.</i>
אַיְנָהָרָא Irenæus.	אַיְלָבָת S. Elisabeth <i>mater S. J.</i> <i>Baptistæ.</i>
אַיְנָאָסָאָא et אַיְנָאָסָאָא Ismael ; אַיְנָאָסָאָא et אַיְנָאָסָאָא Ismaelite.	אַיְלָאָזָעָס Elisæus <i>propheta.</i>
אַיְנָאָסָמָס S. Acepsimas <i>mart.</i>	אַיְלָהָדָמָרָה Alexander <i>rex.</i>
אַיְלָהָלָה Achilles.	אַיְלָהָלָה et אַיְלָהָלָה Alexandria ; <i>et</i> אַיְלָהָלָה et אַיְלָהָלָה Alexandrinus.
אַיְלָהָלָה Xenias <i>pr. m.</i>	אַיְלָהָלָה Holophernes <i>dux.</i>
אַיְלָהָלָה Elam <i>provincia.</i>	אַיְלָהָלָה Aleus, <i>ar.</i> אַלְרָש, <i>pr.</i> <i>vici prope Ninivem.</i>
אַיְלָהָלָה Allemania seu Germania.	אַיְלָהָלָה et אַיְלָהָלָה S. Ambrosius.
אַיְלָהָלָה et אַיְלָהָלָה Eλλάς, Græcia.	אַיְלָהָלָה et אַיְלָהָלָה Amida <i>urbs</i> <i>Mesopotamiæ (hod. Diarbe-kir).</i>
אַיְלָהָלָה Albania Georgiæ <i>pro-vincia;</i> et אַיְלָהָלָה Albani.	אַיְלָהָלָה Ammonita.
אַיְלָהָלָה Deus vicit, Allazacha, <i>pr. m.</i>	אַיְלָהָלָה et אַיְלָהָלָה et אַיְלָהָלָה Ammonius.
אַיְלָהָלָה et אַיְלָהָלָה奥林匹וס mons.	אַיְלָהָלָה Amasias <i>rex Juda.</i>
אַיְלָהָלָה et אַיְלָהָלָה Olympia Græciæ <i>provincia;</i> it. ludi Olympici ; Olympias spatiū quatuor annorum ; et אַיְלָהָלָה奥林匹וס ; cœlestis ; trop. Olympicus ; cœlestialis ; trop. cœlum.	אַיְלָהָלָה Amasia <i>urbs Pontis.</i>
אַיְלָהָלָה et אַיְלָהָלָה Elias proph.; et אַיְלָהָלָה ad Eliam spec-tans.	אַיְלָהָלָה Amorrhæus.
	אַיְלָהָלָה Amorium u. Phrygiæ.

اًمَّدَنْتَهُ	Amanus mons prope Antiochiam.	اًمَّهْنَهُهُ	Anicetus <i>papa.</i>
اًمَّفُهُهُكُس	Empedocles philos.	اًمَّهْلَهُهُهُ	Anaxagoras <i>phi-</i> <i>losophus.</i>
اًبَّهَكَهَهُ	Anglia.	اًمَّهْنَهُهُ	Anastasius <i>imperator.</i>
اًبَّهُهُهُهُ	S. Andreas apostolus.	اًمَّهْنَهُهُهُ	Ecclesia Resur-
اًمَّهْنَهُهُ	Honorius <i>papa.</i>	اًمَّهْنَهُهُهُهُ	rectionis <i>Jerosolymis.</i>
اًمَّهُهُهُ	Enos f. Seth.	اًمَّهْنَهُهُهُهُ	Anastasiopolis <i>u. Dara in Mesopotamia.</i>
اًمَّهُهُهُ	Nazianzum urbs Cap- padociae.	اًمَّهُهُهُهُهُ	Angora <i>u. Galatice.</i>
اًمَّهُهُهُهُ	S. Antonius abbus; pl. et	اًمَّهُهُهُهُهُ	Asa rex Juda.
اًمَّهُهُهُهُهُ	Antonianus mo- nachus.	اًمَّهُهُهُهُهُهُ	Ves- pasianus <i>imperator.</i>
اًمَّهُهُهُهُ	Antinoe urbs <i>Egypti.</i>	اًمَّهُهُهُهُهُهُ	Hospitalarius <i>eques.</i>
اًمَّهُهُهُهُ	Antiochia ; aera Antioche- norum (<i>ante C. 48.</i>)	اًمَّهُهُهُهُهُ	Asuan seu Syene <i>u.</i> <i>Egypti.</i>
اًمَّهُهُهُهُ	Antiochus rex.	اًمَّهُهُهُهُهُ	Astyages <i>rex Medus.</i>
اًمَّهُهُهُهُهُ	'Antichristos, Antichristus.	اًمَّهُهُهُهُهُهُ	S. Stephanus <i>protomartyr.</i>
اًمَّهُهُهُهُهُ	Antilibanus mons <i>Syriæ.</i>	اًمَّهُهُهُهُهُهُ	Asia ; <i>scepe Asia Minor.</i>
اًمَّهُهُهُهُهُ	Anatolius.	اًمَّهُهُهُهُهُهُ	Assyria <i>provincia.</i>
اًمَّهُهُهُهُهُهُ	Antaradus <i>u. Syriæ.</i>	اًمَّهُهُهُهُهُهُهُ	Asmodaeus <i>diabolus.</i>
اًمَّهُهُهُهُهُهُ	Onesimus pr. m.	اًمَّهُهُهُهُهُهُهُ	Asaph <i>cantorum princeps.</i>
		اًمَّهُهُهُهُهُهُهُ	Hispania <i>regio.</i>
		اًمَّهُهُهُهُهُهُهُ	etc., desertum Scete.
		اًمَّهُهُهُهُهُهُهُ	Gens Selavorum, ar. الصَّالِبة .
		اًمَّهُهُهُهُهُهُهُ	Asclepiades f. <i>Esculapii.</i>
		اًمَّهُهُهُهُهُهُهُ	Aesculapius <i>medicus.</i>

אֶשְׁתָּרֵה	<i>Esther regina.</i>
אַסְטָרְטָה	<i>Astarte seu Venus.</i>
אַפְּלוֹנִיוס	<i>Apollo.</i>
אַפְּלוֹנִיוס	<i>Apol-lonius Thyanæus philosophus.</i>
אַפְּולִינָרִיוס	<i>Apollinarius hære-ticus.</i>
אַפְּיפָנִיוס	<i>S. Epiphanius.</i>
אַפְּפִיאִיוס	<i>Appius pr. m.</i>
אַפְּיפָנִיוס	<i>Epipha-nes Antiochus rex.</i>
אַפְּיקְרָעָרָס	<i>Epicurus philos.</i>
אַפְּיְקְטָה	<i>Epictetus philos.</i>
אַפְּוֹנְטִיאָנִיוס	<i>Auxentius pr. m.</i>
אַפְּמָאֵה	<i>Apamæa urbs Syriæ.</i>
אַפְּהֵסָה	<i>Ephesus u. Asiæ.</i>
אַפְּחָאָה	<i>aphaca u. in Libano.</i>
אַפְּרָהָאתְס	<i>Aphraates sapiens Persa.</i>
אַפְּרָהָאתְס	<i>et Aphrodite, Venus.</i>
אַפְּרָהָאתְס	<i>regio Euphratensis.</i>
אַפְּרָהָאתְס	<i>S. Ephrem Syrorum doctor egregius.</i>
אַפְּרָהָאתְס	<i>metrum Ephremi-cum septem syllabis constans.</i>
אַפְּרָהָאתְס	<i>et Africæ Africa.</i>
אַפְּרָהָאתְס	<i>Africanus scriptor.</i>
אַפְּרָהָאתְס	<i>et Francia, Gallia; Franci.</i>
אַפְּרָהָאתְס	<i>Ephrata cogn. Bethlehem.</i>
אַפְּרָהָאתְס	<i>ut S. Euthymius.</i>
אַפְּרָהָאתְס	<i>Ispahan metr. Persidis.</i>
אַפְּרָהָאתְס	<i>Ecbatana u. regia Persarum, v. حَلَانًا.</i>
אַפְּרָהָאתְס	<i>Academia; أَمْبَامَةٌ Academici philosophi.</i>
אַפְּרָהָאתְס	<i>Aquila judæus scriptor.</i>
אַפְּרָהָאתְס	<i>et Aquileia n. Italiæ.</i>
אַפְּרָהָאתְס	<i>Aksara u. Anatolice.</i>
אַפְּרָהָאתְס	<i>Acephali hæretici.</i>
אַפְּרָהָאתְס	<i>et Acacius pr. m.</i>
אַפְּרָהָאתְס	<i>Cascar u. in Chaldaea, al. Edessa, al. Ur.</i>
אַפְּרָהָאתְס	<i>Arabia; أَوَّاحَدٌ Arabes, cfr. كُسْتَانٌ.</i>
אַפְּרָהָאתְס	<i>Areopagita S. Dionysius.</i>
אַפְּרָהָאתְס	<i>v. حَوْلًا.</i>
אַפְּרָהָאתְס	<i>Arbela u. Iracæ.</i>
אַפְּרָהָאתְס	<i>et Argis u. Ar-meniac.</i>
אַפְּרָהָאתְס	<i>Ardabad u. Persidis.</i>
אַפְּרָהָאתְס	<i>et Aradus insula Syriæ.</i>
אַפְּרָהָאתְס	<i>Artaxerxes rex.</i>
אַפְּרָהָאתְס	<i>ar. الرָהָ, ur. Edessa, a nom. Orrhoë fundatore.</i>
אַפְּרָהָאתְס	<i>Cupido, inde amor carnalis.</i>
אַפְּרָהָאתְס	<i>et أَفْرَادُهُ Aristoteles philosophus; etc., Aristoteles philosophus;</i>

أَوْمَعْدَه لُكْمَا	etc. Aristotelicus.
أَوْلَادْه إِرْيَثْرَا	Erythra u. <i>Egypti</i> .
أَوْلَادْه أَرْزُنْتِيْسْ رِجِيُو	Arzunitis regio; it. u. Erzerum, ar. أَرْزُنْ الرُّوم et et آرْزُرُوم.
أَوْلَادْه آرْتِمِيْسْ	Artemis seu Diana.
أَوْلَادْه آرِيُوسْ	Arius hæresiaracha; et آرِيُوسْ آرِيَانُوسْ Arianus.
أَوْلَادْه هِيرَابُولِيسْ	Hierapolis (ar. قَنْبِيجْ).
أَوْلَادْه أُرِيْجِينَسْ	Origenes.
أَوْلَادْه آرْغُونْ	et آرْغُونْ 'Aργον, Mars.
أَوْلَادْه آرِيْسِيدِيْسْ	Aristides apologeta.
أَوْلَادْه إِرِيْخْ	et إِرِيْخْ Erech; Edessa;
أَوْلَادْه مَسَوْلَاتِيْه	Cascara urbs Mesopotamiae.
أَوْلَادْه آرْكِيْمِيْدَه	Archimedes physicus.
أَوْلَادْه آرْكِلَاهُسْ	et آرْكِلَاهُسْ آرْكِلَاهُسْ Archelaus rex.
أَوْلَادْه آرَامْ	Aram, Syria; آرَامْ سَيْرَاهْ
أَوْلَادْه مَسَوْلَاتِيْه	Mesopotamia; آرَامْ سَيْرَاهْ Aramaeus, Syrus; آرَامْ آرَامْ gentilis, ethnicus.
أَوْلَادْه هِرْمَاسْ	et هِرْمَاسْ Hermas pr. m.
أَوْلَادْه جَرِيمِيَا	Jeremias propheta.
أَوْلَادْه هِرْمَيْسْ	'Eρμην, Hermes, Mercurius.
أَوْلَادْه آرْمِنِيَا	et آرْمِنِيَا آرْمِنْ Armenia.
أَوْلَادْه آرْنَالْدُوسْ	Arnaldus princeps Francorum.
أَوْلَادْه آرْنُونْ	Arnon vallis.
أَوْلَادْه آرْسُوفْ	Arsoph arx munita Palæstinæ.
أَوْلَادْه آرِيْسْتُوْبُولُوسْ	Aristobulus.
أَوْلَادْه آرِيْسْتُوسْ	Aristus pr. m.
أَوْلَادْه آرْسِنِيُوسْ	S. Arsenius.
أَوْلَادْه أُرْفَهُسْ	Orpheus.
أَوْلَادْه آرْفَاخَادْ	et آرْفَاخَادْ آرْفَاخَادْ Arphaxad; حَتَّىْ آرْفَاخَادْ Chaldae.
أَوْلَادْه آرْكَادِيُوسْ	آرْكَادِيُوسْ Arcadius imperator.
أَوْلَادْه هِرَاكْلِيُوسْ	آرْكَلِيُوسْ Heraclea nom. pl. urbium.
أَوْلَادْه هَرْكُلِيُوسْ	Hercules.
أَوْلَادْه آرْسَاصِيْسْ	et آرْسَاصِيْسْ Arsaces rex Persarum; آرْسَاصِيْسْ Arsacida.
أَوْلَادْه آرْسَاصِيْسْ	Arsam rex Persarum; حَدَّه آرْسَاصِيْسْ Beth-Arsam u. in Chaldaea.
أَوْلَادْه آرِيْثَاسْ	et آرِيْثَاسْ آرِيْثَاسْ ar. الحارث, Arethas pr. m.
أَمْبُوْزْ	Azotus u. Palæstinæ, cfr. آمْبُوْزْ et آمْبُوْزْ.
أَسْسُورْ	Assur, Assyria.
أَسْرِيَا	Aser f. Jacobi.
أَسْجَنَه	Ascenez fil. Gomer, et n. regionis.
أَمْحَدَنْ	v. آمْحَدَنْ.
أَسْيَايَا	Isaias propheta.
أَسْكَلُونْ	Ascalon u. Palæstinæ; آسْكَلُونْ آسْكَلُونَتَه.
أَسْسُورْ	et آسْسُورْ آسْسُورْ Assyria, cfr. آسْسُورْ آسْسُورْ Assyrius.
أَثِيْنِيَه	et آثِيْنِيَه آثِيْنِيَه, آثِيْنِيَه Athenæ; آثِيْنِيَه Atheniensis.

ح

حَلَّيْتَنَا Batanæa regio.

حَلَّمَهُمْ et حَسْهَمَ S. Bassus
mart.

حَلَّا هَلَكَمَهُ , حَلَّمَهُ et
حَسْكَنَهُ S. Basilius.

حَلَّوْتَنَا S. Barbara virgo
mart.

حَلُوْبَهُ Baruch propheta.

حَلَّبَهُ et حَلَّبَ Babæus episc.
Chaldaeorum.

حَلَّلَهُ et حَلَّلَ Babylon urbs et
provincia ; حَدَّلَهُ Babylonius.
حَلَّبَهُ ابُو et حَلَّبَهُ Bagdad metro-
polis Iracæ.

حَلَّبَهُ et حَلَّبَهُ , ar. بَنْرَاسِ ,
Pagræ u. Syriae (hod. Ba-
gras).

حَلَّبَهُ Badlis u. Armeniæ.
حَلَّبَهُ ابُو فَارَانَهُ Bahram seu Varanes
rex Persarum.

حَلَّبَهُ ابُو , ar. بَخَارَى , Bokhara u.
Transoxianæ.

حَلَّبَهُ ابُو , ar. بَخْتِشُورَهُ , Bokht-
jesus medicus.

حَلَّبَهُ ابُو et حَلَّبَهُ Bulgari.
حَلَّبَهُ ابُو et حَلَّبَهُ Bosra

metropolis Arabiae, ar. بَصْرَى ;
it. u. Iracæ, ar. الْقَصْرَة .

حَلَّبَهُ ابُو , حَلَّبَهُ ابُو , لَهَنَّا , حَنَّا et

حَنَّا , ar. بَيْرُوت , Berytus u.
Phœnicie.

حَسَّمَهُ , ar. الْبَخْرَنِ , Bahraïn
regio ap. sinum Persicum.

حَهَنَهُمْ Patricius pr. m.
حَهَنَهُمْ Berenice pr. f.

حَنَّا et حَنَّا , ar. الْبَرَّةَ , Birta
seu Bira u. Euphratensis.

حَنَّهُ مَمْ , حَنَّهُ v. ,

حَمَعَان Bischara vicus Libani.

حَدَّهُ domus, ager, multis nomi-
nibus præfigitur ad personas,
familias, vicos, urbes, regio-
nes indicandas.

حَمَدُهُ ابُو مُهَمَّهُ Adamus; gens humana.

حَمَدُهُ ابُو مُهَمَّهُ Aaron; ordo leviticus.
حَمَدُهُ ابُو مُهَمَّهُ Eutychetis asseclæ.

حَمَدُهُ ابُو مُهَمَّهُ Ayoubitarum dynas-
tia.

حَدَّلَهُ Bethel u. Palæstinæ.

حَدَّلَهُ ابُو مُهَمَّهُ Israel; Israelitæ.

حَدَّلَهُ ابُو مُهَمَّهُ Assyria.

حَدَّلَهُ ابُو مُهَمَّهُ Aristotelici.

حَدَّلَهُ ابُو مُهَمَّهُ Beth-Arsam u.
Chaldaæ.

حَدَّلَهُ ابُو مُهَمَّهُ Beth-Garmai Assy-
riæ provincia.

حَادَّهُ ابُو مُهَمَّهُ , et contr. Ba-
darona u. Assyriæ.

حَرَانِي	Hagareni <i>sen</i> Ismaelite.	بَطْفَاجِي	Bethphage <i>prope</i> Bethaniam.
حُزَيْتِي	Huzitis <i>regio</i> Irae, ar. اَلْهَوَازْ.	بَلَسْطِينَا	Palaestina.
حُنُورِي	Hunnorum gens.	بَرْسَارُومَا	regio Persarum.
بَشْرِي	Beth-Vasiq <i>u.</i> Assyriae.	بَثْسَادِي	Bethsaida <i>u.</i> Galilæa.
بَذْبَدِي	Beth-Zabde <i>u.</i> et insula in Tigride.	سَيْنَارِي	Sinarum regio.
بَنْجَمِي	, ar. بَنْجَمِي, Homeritæ gens Arabice Felicis.	بَرْمَيْنِي	, ar. الْقَدْسُ, urbs Jerusalem.
بَنْدَلِي	socii Ananiae : Pueri tres Danielis socii.	بَرْتَرَامِي	Beth-Raman <i>u.</i> Mesopotamie.
بَثْسَدَا	Bethesda piscina in Jerusalem.	بَثْسُورَا	Bethsura <i>u.</i> Palestinae.
بَرْرَانِي	province Harran seu Charrorum in Mesopotamia.	بَثْسَامِي	Bethsames <i>u.</i> Judæa ; Heliopolis.
بَرْجَدِي	tribus Juda ; Judæi ; Machabæi.	بَرْتَرَنِي	Christiani Arabes Taalabenses <i>seu</i> Scenitæ.
بَرْسَانِي	et Bethsan <i>seu</i> Basan <i>u.</i> trans Jordanem ; it. regio Basanitis.	بَرْيَنِي	Bithynia provinciae.
بَلْهَامِي	Bethlehem.	بَرْكَهُوسِي	S. Bacchus martyr.
بَرْمَلِي	وَسَانِي socii Michaelis : ordo Archangelorum.	بَلَادِي	Balada <i>u.</i> Mesopotamie.
بَرْسَانِي	Sasanidarum dynasty.	بَلَهَسَرِي	Balthasar rex Babylonis.
بَرْلَهُوسِي	Seleucia <i>u.</i> ap. Tigridem.	بَلَالِي	Balai poeta Syrorum.
بَرْتَهَانِي	Bethania.	بَلِيلِي	Beliar <i>seu</i> Belial dæmon.
بَرْتَهَبِي	Beth-Arbaia <i>u.</i> Mesopotamiae.	بَلَخِي	Balkh <i>u.</i> Khorasanæ.
		بَلَعَلِي	Balaam propheta.
		بَنَمِي	Venetæ.
		بَنَسِي	Benjamin.
		بَسَانِي	Basan, r. بَسَان.
		بَصَفَرِي	Bosphorus.
		بَالِلِي	Baal <i>idolum</i> .
		بَلِلَهُبِي	Beelzebub.

جُنُبٌ سَّتَّا	Jupiter.	ذَافٌ	<i>filius lapidis</i> , Bar-Cepha
جُنُبٌ قَمْهَةٌ	Beelphegor.	Moyses scriptor Syrus.	
جُنُبٌ مُعْنَى	Jupiter.	ذَنْ	<i>filius Dei</i> Barlaha, scriptor Edessenus.
جُنُبٌ بَلْكَبٌ	et Baalbek seu Heliopolis in Syria.	ذَنْ	Barnabas apost.
جُنُبٌ قَفْرِيٌّ	Beelsephon u. Egypti.	ذَنْ	Bar-Nun Josue f. Nun; it. pr. plurium scriptorum.
جُنُبٌ	Baasa rex Israel.	ذَنْ	Barsamia <i>filius cæci</i> , martyr.
جُنُبٌ	et حُرْفَا	ذَنْ	Bar-Saruaschui lexicographus.
جُنُبٌ	S. Pancratius mart.	ذَنْ	Bar-Serapion Joan- nes medicus.
ذَنْ	, pl. حُسْنَاتٍ	ذَنْ	Bar-Hebraeus Grego- rius Abulfaragius scriptor egregius Jacobita.
ذَنْ	, f. حُسْنَةٍ	ذَنْ	Bar-Ali lexicographus.
ذَنْ	, pl. حُسْنَاتٍ	ذَنْ	ذَنْ filia Parthorum, cognomen Edessæ.
ذَنْ	filia Jerusalem seu urbs vel incolæ Jerusalem.	ذَنْ	ذَنْ filius tinctorum, Bar- Saboe, cognomen S. Simeonis patriarchæ et mart.
ذَنْ	filius Jesse David.	ذَنْ	ذَنْ Bar-Sudaili, Stephanus Edessenus scriptor.
ذَنْ	، حُسْنَةٍ، حُسْنَاتٍ	ذَنْ	ذَنْ filius jejunii, Barsumas, pr. plurium virorum, quo- rum notior est metropolita Nisibenus Nestorianismi pro- pugnator.
ذَنْ	Ommiada- rum dynastia.	ذَنْ	ذَنْ Bar-Salibi, Dionysius scriptor celeber.
ذَنْ	Bar-Bahul, lexi- cographus.	ذَنْ	ذَنْ filii tonitru, Buaner- ges, cogn. filiorum Zebedæi.
ذَنْ	filius quatuor nomi- num, Barbasemius martyr.		
ذَنْ	filii deserti, Arabes nomades.		
ذَنْ	Bardesanes hæreticus, a nomine fluminis Edesseni- sic vocatus; ذَنْ asseclæ Bardesanis.		
ذَنْ	filius diei domini- cæ, Barhadbeschaba pr. m., (cfr. ar. عبد الأحد Dominicus).		

filius tonitru, cogn. S.	Britannia.
Joannis Apost.	
et	
Bartholomaeus Apost.	S. Barlaam.
Borboriani hæretici.	Porphyrius pr. m.
Berberi gens Mauritanice.	
Beroe seu	Barac dux.
Alepub urbs.	
Berytus urbs	Bithynia, ut
Phœnicie, ar.; يَنْدُوت; cfr. حَمَّا.	Botrys, ar. بَثْرُون, u. Phœnicie.

et	Gad fil. Jacobi.
, ar. جَبِيل, Byblus seu	Gethsemani hortus.
Gabal u. Phœnicie.	
et Gades insula.	Gedeon judex Israel.
et	Gadara u. Palæstinæ.
et	Godefri-
S. Georgius martyr.	dus Bullionensis.
Caius pr. m.	
et	Georgiana
Ga-	prov. Persidis.
latia provicia; it. Gallia.	
Galenus medicus.	
et	Gordianus imperator.
S. Gela-	
sius papa.	
Gabaon u. Palæsti-	Khorasan, al.
næ.	Georgia.
et	Gothia seu regio Gotho-
Gabriel	rum.
Archangelus.	
Golgotha seu Cal-	Gaza u. Palæstinæ.
variae locus.	Gazer u. Palæstinæ.
	Mesopotamie; ipsa Mesopo-

tamia ; et مَنْتَمَا Mesopotamiensis.
 Gihon flumen Paradi-
 si ; it. fons prope Jerusalem.
 ad Gihon spectans.
 Galilaea.
 Galaad mons.
 Gomor u. Palæstinæ.
 et et Gangra u.
 Paphlagoniæ.
 Gandisapor u. Per-
 sidis.

Genuenses.
 Gnostici heretici.
 Gennesareth mare Tibe-
 riadis.
 Gergesæorum gens.
 et S. Gregorius.
 Germani.
 Germani-
 cia u. Euphratensis (ar. الْأَرْضُ).
 Gessen regio Ægypti.
 Geth u. Palæstinæ.

S. Damianus martyr.
 Dara seu
 Anastasiopolis u. Mesopota-
 miæ.
 Darius rex.
 Deblath seu Reblath u.
 Syriæ.
 amicus Jesu, Dadjesu
 patriarcha.
 v. Dictionarium.
 David rex ; trop. Psalte-
 rium ; Davidicus.
 Aldoënsis,
 Stephanus Maronitarum pa-
 triarcha.
 Odollam u. Palæstinæ.

et
 Domitianus imp.
 Damascus Syriæ caput,
 v. دَمْسَهُ .
 Dan fil. Jacobi.
 Danubius flumen.
 Dositheus pr. m.
 Decius im-
 perator.
 et
 Diocletianus
 imp.
 S. Dorotheus.
 Dyrrachium urbs Epri.

ج	Dothan pr. loci.	ج	Demophilus pr. m.
ج	Diogenes philos.	ج	Demetrius rex.
ج	Didymus pr. m.	ج	Dioscorides medic.
ج	et	ج	Daisan flumen Edessæ, v.
ج	Diodorus pr. m.	ج	Decapolis.
ج	, plur. virorum, inter-	ج	S. Damasus papa.
ج	quos eminet Dionysius Areo-	ج	Damascus metropolis
ج	pagita.	ج	Syriae.
ج	Diospolis u. Phry-	ج	Daniel propheta.
ج	gice.	ج	Daphne suburbium An-
ج	et	ج	tiochiae.
ج	Dioscorus hereticus	ج	Tigris flumen.
ج	monophysita.	ج	Damascus; Damascenus.
ج	al-dīyā, ar.	ج	Damascenus.
ج	Dailam regio Persidis.		

ج

ج	Aaron, ut	ج	Adrianus imperator.
ج	Abel fil. Adami.	ج	Huzitarum
ج	Agar Ismaelis mater;	ج	gens.
ج	et Agareni	ج	Osius
ج	seu Ismaelite.	ج	Cordubensis.
ج	Hadad titulus re-	ج	Hymenæus hereticus.
ج	gum Syriae.	ج	ut
ج	Edessa, v.	ج	Homerus poeta.
ج	et	ج	Hungaria regio.
ج	Aedesius	ج	Hunnorum gens.
ج	pr. m.	ج	Euclides mathematicus.
ج	'Adriaticus, mare Adria-		
ج	ticum.		

هَرْمِيزْدَسٌ et دَمَسُوْنِيْ هَرْمِيزْدَسٌ Hormizdas
deus Persarum; it. pr. pl.
virorum.

هَرْكَانِيَا Hyrcania regio ad
Caspium mare. مَدَنْيَا وَهَرْكَانِيَا Mare Caspium.

جَوْسِيْهُ Josue Moysis successor.

إِبَاسٌ Ibas Edessenus.

هَرْدِيَا et هَرْدِيَا Herodia pr. f.

هَرْدِيَا et هَرْدِيَا Herodes
rex; هَرْدِيَا وَهَرْدِيَا et هَرْدِيَا Herodiani.

هَرْكَانُوسٌ et هَرْكَانُوسٌ Hyrcanus
rex.

هَاتِيمٌ Haithum sive Hatem
Armenorum rex.

إِلَيْا, إِلَيْا et إِلَيْا Ellyas,
Græcia.

إِلَيْا, إِلَيْا et إِلَيْا S. Helena
Constantini mater.

هَلِيُولِيْپُولِيْسٌ, هَلِيُولِيْپُولِيْسٌ et
هَلِيُولِيْپُولِيْسٌ Heliopolis urbs
Egypti; it. u. Syriæ.

هَلِيُولِيْپُولِيْسٌ, هَلِيُولِيْپُولِيْسٌ et
هَلِيُولِيْپُولِيْسٌ Hellespontus
regio.

إِلْبِيْدِيْسٌ et إِلْبِيْدِيْسٌ Elpi-
dius pr. m.

هَامَدَانٌ et هَامَدَانٌ, ar., Ha-
madan u. Persarum.

هَيْدِيْسٌ Indus fluvius; ipsa India;
هَيْدِيْسٌ Indicus, Æthiops, Cu-
schita.

إِپِرِيَا et إِپِرِيَا Epirus regio.

هَقْتُرٌ Hector.

هَرُودُوْتُسٌ Herodotus histori-
cus.

هَرُودِيُونٌ Herodion pr. m.

هَرَاتٌ, ar. هَرَاتٌ, Herat caput
Khorasanæ; هَرُومَنَا incola
urbis Herat.

هَرْمُوْنِيْسٌ Hermogenes. pr. m.

هَرْمُوْنِيْسٌ Еρμηνος, Hermes, Mer-
curius; Hermes trismegistus.

هَرِيْسٌ Heres seu Leontopolis
u. Egypti.

هَرْكُلِيْسٌ et هَرْكُلِيْسٌ Hercules.

هَرَقْلِيْسٌ et هَرَقْلِيْسٌ et هَرَقْلِيْسٌ Herac-
lides philosophus.

هَرَقْلِيْسٌ, هَرَقْلِيْسٌ et هَرَقْلِيْسٌ Heraclius.

هَرَقْلِيْسٌ Heraclea urbs.

هَالِيْنِيَانٌ et هَالِيْنِيَانٌ Vale-
rianus imperator.

هَالِيْنِيَانٌ et هَالِيْنِيَانٌ et هَالِيْنِيَانٌ

Valentinianus imp.

هَالِيْنٌ et هَالِيْنٌ Valens imp.

هَالِيْنِيَانٌ et هَالِيْنِيَانٌ et هَالِيْنِيَانٌ

et مَكْنُونٌ Valentinus Gnosticus.	مَكْنُونٌ et مَكْبُرٌ Hollan- dia, Batavia.
مَكْنُونٌ et مَكْنُونٌ Vale- rianus imp.	مَيْسُونٌ rosa, Varda Syrus poeta ; it. pr. f.
مَهْلَكٌ, ar. طَاسِطٌ, Wasit n. Iracæ.	مَهْلَكٌ Vararanes rex Persa- rum.
مَكْنُونٌ et مَكْنُونٌ Vologesus rex Parthorum.	مَكْنُونٌ Vasti uxor Assueri.

1

أَدْنَا et الرَّابُّ , ar. Zabas flu- men.	أَوْحَدًا Zeugma u. prope Euph- ratem.
أَمْهُصٌ et أَمْهُصٌ Zεύς , Jupiter ; trop. plumbus.	أَمْهُصٌ et أَمْهُصٌ Azotus u. Pa- læstinæ, v. اَمْهُصٌ et اَمْهُصٌ .
أَنْهَمْصٌ , اَنْهَمْصٌ , اَنْهَمْصٌ et اَنْهَمْصٌ Zenos- bius pr. m.	اَنْهَمْصٌ Zorobabel princeps transmigrationis.
أَنْهَمْصٌ etc. Zenobia regina.	أَنْهَمْصٌ Zeno imp.
أَوْهَمْصٌ et اَوْهَمْصٌ Zoroastres Persarum legislator.	أَقْتَ زacchæus publicanus.
أَحْبَابٌ et اَحْبَابٌ Zebedæus.	أَخْرَى Zacharias propheta.
أَحْكَمٌ et اَحْكَمٌ Zabulon f. Jacobi. أَحْنَى emptus, Zebinas martyr.	أَحْفَنْ Zapharan, monasterium sedes patriarchor Jacobiti- tarum prope Mardin.
أَوْهَمْصٌ justus, Sadoc sacerdos ; أَوْهَمْصٌ v. Dict.	أَوْسٌ Zara pr. m.

1

سَاحِدُوا , ar. سَاحِدُوا et سَاحِدُوا , S. Habib mar-
tyr. Chaboras flumen. خابور

مُحَمَّد	Habaeus propheta.	مُكَدَّس	et مُكَدَّس , ar. حُوان , u. Persidis.
مُحَمَّد	Hebron u. Judæe.	مُكَدَّس	Alphæus pater s. Jacobi Minoris.
مُكَدَّس	, ar. الجَبَش , Abyssinia , Ethiopia ; مُحَمَّد Abyssinorum gens.	مُكَدَّس	مُكَدَّس et مُكَدَّس Helcias pr. m.
مُكَدَّس	Aggæus propheta.	مُكَدَّس	Cham f. Noe.
مُكَدَّس	et مُكَدَّس , ar. Adiabene Assyriæ provincia ; مُكَدَّس Adiabenus.	مُكَدَّس	جُصْنَى et سُقُون Emesa , ar. u. Syriæ ad Orontem.
مُكَدَّس	et مُكَدَّس , ar. الحَدِيَّة , urbs nova , Hadeth plurium urbium nomen.	مُكَدَّس	مُكَدَّس Homeritæ gens Arabie Felicis.
مُكَدَّس	Eva protoparens.	مُكَدَّس	et مُكَدَّس Hemath u. Syriæ ad Orontem , ar. حَمَّة .
مُكَدَّس	Hevila pr. viri et nom. regionis.	مُكَدَّس	مُكَدَّس Enoch patriarcha.
مُكَدَّس	mons Horeb.	مُكَدَّس	مُكَدَّس Annas pontifex judæus.
مُكَدَّس	Auranitis regio.	مُكَدَّس	مُكَدَّس Ananus pr. m.
مُكَدَّس	Azael rex Syriæ.	مُكَدَّس	مُكَدَّس Ananias pr. m.
مُكَدَّس	Ezechias rex Juda.	مُكَدَّس	castellum , inde pr. plurium locorum.
مُكَدَّس	Ezechiel propheta.	مُكَدَّس	مُكَدَّس Heftoun u. Adiabenis.
مُكَدَّس	, ar. الْحَضْر , Hatra u. Mesopotamie.	مُكَدَّس	مُكَدَّس Haruritæ , ar. الْحَرُورَيَّة Arabum secta.
مُكَدَّس	ar. كَفَافا , Kepha urbs prope Carmelum.	مُكَدَّس	مُكَدَّس Hermon mons.
مُكَدَّس	ar. حِيرَة , Hirta urbs Irace.	مُكَدَّس	et مُكَدَّس , ar. حَرَان Carrhæ u. Mesopotamie ; مُكَدَّس Hara-nenses ; Sabæi.
مُكَدَّس	Heth f. Chanaan ; مُكَدَّس Hethæus.	مُكَدَّس	مُكَدَّس Heraclea u. Syriæ ;
مُكَدَّس	et مُكَدَّس Alepus urbs , v. مُكَدَّس ; دَهْلَه Alepensis.	مُكَدَّس	مُكَدَّس Heracleensis.
		مُكَدَّس	مُكَدَّس Hesebon u. Palæstine.
		مُكَدَّس	et مُكَدَّس Xerxes f. Darii.

تَاتِيَانُس *et* تَاتِيَانُس Tatianus
scriptor.

دَرْكَسْ دَرْكَس doreas, Tabitha pr. f.

تِبَرِيَّا تِبَرِيَّا et تِبَرِيَّا Tiberias
urbs Galilæe.

تِبَرِيَّا تِبَرِيَّا et تِبَرِيَّا Tiberius
imp.

تِيَانَا تِيَانَا Tyana u. Cappadociae.

تَوْبَاسْ تَوْبَاسْ et تَوْبَاسْ Tobias.

تُوسْ تُوسْ Tus u. Chorasance.

مَوْلَى مَوْلَى mons, præfigitur multis
nom. propriis locorum.

تُورَّا تُورَّا et تُورَّا تُورَّا Tur-Ab-
din regio in Mesopotamia.

أَلْيَوْنْ أَلْيَوْنْ mons Oliveti.

سَيْنَاء سَيْنَاء mons Sinai.

تُورْسْ تُورْسْ et تُورْسْ تُورْسْ Turcia ;
Turca.

تِيتُوس Titus imp.

تِيمُونْ تِيمُونْ vide Diction.

تِيمُونْ تِيمُونْ Timon Diaconus.

تِيمُونْ تِيمُونْ ، تِيمُونْ تِيمُونْ ،
تِيمُونْ تِيمُونْ ، تِيمُونْ تِيمُونْ et
تِيمُونْ تِيمُونْ S. Timotheus.

تِيمَعْ تِيمَعْ Timaeus pr. m.

تِرايَانُسْ تِرايَانُسْ et تِرايَانُسْ Trajanus imp.

تِراخُونِيَّةْ تِراخُونِيَّةْ Trachonitis
regio.

تِراپِيزْ تِراپِيزْ et تِراپِيزْ Trapezus urbs Armenie (gall.
Trébizonde).

تِرْفِيْهْ تِرْفِيْهْ S. Trophimus.

تِرْبِلِيْسْ تِرْبِلِيْسْ Tripolis u. Phœniciae.

تَارْسُسْ تَارْسُسْ et تَارْسُسْ تَارْسُسْ Tarsus u.
Cilicie.

جَائِرْ جَائِرْ Jaïr pr. m.

جَانُوَارِيُّسْ جَانُوَارِيُّسْ Januarius pr. m.

جَبُوْسْ جَبُوْسْ Jebus antiqua u. Jeru-
salem ; جَبُوْسْ جَبُوْسْ Jebusæus.

جَابِنْ جَابِنْ et جَابِنْ جَابِنْ Jabin rex Asor.

جَابِرُودْ جَابِرُودْ ar. جَابِرُودْ Jabrud u.
Syriæ.

جَاهُورِيَّةْ جَاهُورِيَّةْ Oighouritæ, Turcæ
Orientales.

جَهَّا جَهَّا Dei venerandum nomen in
hebr., multis nominibus pro-
priis suffigitur.

جَابَلَاهَا جَابَلَاهَا Deus dedit, Jabal-
laha pr. m.

مُهَمَّادٌ et مُهَمَّادٌ donatus,	Joiada sacerdos.
Ibas Edessenus.	
يَهُلُو جَاهُلُو rex Israel.	Jochabed mater
يَهُاچَاهُ جَاهَزْ f. Jehu.	Mosis.
يَهُدَاهُ et يَهُدَاهُ Judaea.	Jechonias rex
يَهُدَاهُ Judas f. Jacobi; مُهُودَاهُ Judaeus; مُهُودَاهُ et مُهُودَاهُ id; اِلْهُودَاهُ et اِلْهُودَاهُ Judaismus.	Juda.
يَهُدَاهُ Judith.	Julianus n. pl. virorum.
يَهُرَامْ جَارَامْ rex Juda.	Julius pr. m.
يَهُرَامْ et يَهُرَامْ Josaphat rex Juda.	Julia pr. f.
يَهُأَبْ Joab dux.	S. Julitta f. martyr.
يَهُأَيلْ Joel propheta.	Græcia; مُهَنْدَسْ Græcus, v. Diction.
يَهُأَيَهُمْ et يَهُأَيَهُمْ Joachim rex Juda.	Jonadab f. Rechab.
يَهُأَيَهُمْ Jaïrus archisynagogus.	Justus pr. m.
يَهُأَيَهُمْ Joas rex Juda.	Justinus pr. pl. virorum.
يَهُأَيَهُمْ et يَهُأَيَهُمْ Joatham rex Juda.	Justinianus imp.
يَهُأَيَهُمْ Juvenalis patriarcha Hieros.	Josephus Flavius historicus.
يَهُأَيَهُمْ Jovianus imp.	Josephus f. Jacobi; it. pater nutritius Christi et sponsus B. M. V.
يَهُأَيَهُمْ et يَهُأَيَهُمْ Jovianus imp.	Joppe u. maritima Palæstinæ.
يَهُدَاهُ Judas, v. يَهُدَاهُ ; مُهُودَاهُ Judaeus.	Jeroboam rex Israel.
يَهُدَاهُ et in forma græc.	Jordanes fluvius.
يَهُدَاهُ et يَهُدَاهُ Josias rex Juda.	Joram rex Israel.
يَهُدَاهُ Joannes n. pl. virorum illustrium.	Jezabel pr. f.
	يزدشیر, ar. مَوْلَهُ, pers. Isdegerd rex Persarum.

جـ زـ دـ بـ دـ هـ	Jazdunducht f.	جـ زـ دـ هـ	Jared patriarcha.
جـ زـ دـ بـ دـ هـ	martyr.	جـ زـ دـ هـ	Hieromax, fl. <i>Palaestinae</i> , ar. يـرـمـوـكـ.
جـ زـ دـ بـ دـ هـ	إـلـيـاـ	جـ زـ دـ هـ	Jesus, S. Nomen Christi, aliorunque nonnullorum;
جـ زـ دـ بـ دـ هـ	إـلـيـاـ	جـ زـ دـ هـ	إـلـيـاـ ad Jesum spectans;
جـ زـ دـ بـ دـ هـ	Jamnia u. Palestine.	جـ زـ دـ هـ	discipulus Jesu; Jesuita.
جـ زـ دـ بـ دـ هـ	فـرـقـةـ	جـ زـ دـ هـ	مـحـبـيـوـ dedit Jesus, pers. دـادـ do-
جـ زـ دـ بـ دـ هـ	form a græca S. Nom.	جـ زـ دـ هـ	num, Jesuad episc. et scriptor.
جـ زـ دـ بـ دـ هـ	Jesu.	جـ زـ دـ هـ	جـسـدـ وـسـ Jesus apparuit, Jesu-
جـ زـ دـ بـ دـ هـ	إـسـرـائـيلـ	جـ زـ دـ هـ	denha episc. et scriptor.
جـ زـ دـ بـ دـ هـ	إـسـرـائـيلـ	جـ زـ دـ هـ	أـدـ دـادـ اـدـ مـقـدـ وـسـ vicit Jesus,
جـ زـ دـ بـ دـ هـ	Jacob, n. pl. vir.	جـ زـ دـ هـ	Jesuzacha episc. et scriptor.
جـ زـ دـ بـ دـ هـ	جـمـعـهـ حـدـاـ	جـ زـ دـ هـ	جـمـعـهـ حـدـاـ dedit Jesus, Jesujab
جـ زـ دـ بـ دـ هـ	seu sectator Jacobi Baradæi	جـ زـ دـ هـ	patriarcha.
جـ زـ دـ بـ دـ هـ	fautoris Monophysitismi.	جـ زـ دـ هـ	جـمـعـهـ حـدـاـ cum eo Jesus, Jesu-
جـ زـ دـ بـ دـ هـ	Japhet f. Noe.	جـ زـ دـ هـ	ame pr. m.
جـ زـ دـ بـ دـ هـ	Jephte judex Israel.	جـ زـ دـ هـ	جـمـعـهـ حـدـاـ spes nostra Jesus,
جـ زـ دـ بـ دـ هـ	Jaktan, Arabum pater,	جـ زـ دـ هـ	Jesusabran pr. m.
جـ زـ دـ بـ دـ هـ	ar. يـقـطـانـ et communius .		

كـ

جـ زـ دـ بـ دـ هـ	Cephas cogn. S. Petri.	جـ زـ دـ هـ	قـتـنـاـ incolæ regionis Chatai.
جـ زـ دـ بـ دـ هـ	Choresmia urbs Persidis.	جـ زـ دـ هـ	قـصـىـ Chios insula.
جـ زـ دـ بـ دـ هـ	خـارـجـاـ et دـهـوـمـاـ	جـ زـ دـ هـ	قـحـبـاـ v. Diction.
جـ زـ دـ بـ دـ هـ	Khorasana regio.	جـ زـ دـ هـ	قـكـحـاـ Calicut n. maritima
جـ زـ دـ بـ دـ هـ	Curdorum gens.	جـ زـ دـ هـ	Indiarum.
جـ زـ دـ بـ دـ هـ	Cusch f. Cham; it. nomen urbis; قـصـىـ Cuschita, Æthiops.	جـ زـ دـ هـ	قـحـبـاـ et دـهـوـمـاـ , قـحـبـاـ Chaledon n. Bithynice;
جـ زـ دـ بـ دـ هـ	Cottayam u. Malabarica.	جـ زـ دـ هـ	قـحـبـاـ Chaledonius; inde Concilii Chaledonensis de-
جـ زـ دـ بـ دـ هـ	سـيـنـاـ et دـهـوـمـاـ Chatai, regio Sinarum septentrionalis ;	جـ زـ دـ هـ	fensor.

حَمِيس	Chamis <i>poeta Syrus.</i>	حَمْفُوسْتَهْ وْ فَهْمَهْ وْ	<i>et</i> حَمْفُوسْتَهْ وْ فَهْمَهْ وْ
حَمَوسْ	Chamos <i>Moabitarum idolum.</i>	كَرَكَ	<i>Christophorus pr. m.</i>
حَنَمْ	Chanaan <i>f. Cham;</i> حَنَمْ	كَرَكَ et فَهْمَهْ , ar. دَنَّا ,	Karak. <i>pr. pl. locorum.</i>
	Chananæus.	كَرَخَ	
حَمَسْ	حَمَسْ et حَمَسْ Xystus <i>papa.</i>	كُوكُوكْ	<i>Korkuk oppidum Mesopotamiae.</i>
حَمَسْ	دَعْنَا , دَعْنَا vicus ; <i>præmittitur</i>	حَرْقَامِسْ	<i>Charcamis u. ad Euphraten.</i>
	<i>multis nominibus locorum.</i>	كَارَماَنِي	<i>Caramani gens persica.</i>
حَمَلْ	حَمَلْ Cafar Tab <i>vic. in Libano.</i>	كَارْمَلُ	<i>Carmelus mons ;</i>
حَمَلْ	حَمَلْ Capharnaum <i>u. Galilæa.</i>	كَارْمَلِيْتَهْ	<i>Carmelita.</i>
حَمَلْ	حَمَلْ Curdorum gens.	كَارْمَسِدَانِيْسْ	<i>Karmse-danensis Georgius lexicographus Maronita.</i>
حَمَسْ	حَمَسْ et حَمَسْ Chrysostomus <i>S. Joannes.</i>	كَاسْكَارَهْ	<i>Cascara u. Chaldææ ;</i>
حَمَسْ	حَمَسْ Christus <i>D. N.</i>	كَاسْكَارِيْنَهْ	<i>incola urbis Cascarae.</i>



لَادِيْسَهْ	لَادِيْسَهْ et لَادِيْسَهْ كَهْمَهْ Laodicea, n. pl. urbium.	لَادِيْسَهْ , ar. الْلَادِيْسَةِ ,	<i>Laodicea u. Phoenicie.</i>
لَادِيْسَهْ	لَادِيْسَهْ et لَادِيْسَهْ كَهْمَهْ Leo n. pl. vir. inter quos eminent Leo Magnus papa.	لَابَنَهْ	<i>Laban socer Jacobi.</i>
لَادِيْسَهْ	لَادِيْسَهْ , لَادِيْسَهْ , لَادِيْسَهْ , لَادِيْسَهْ Leontius episc.	لَبَانُهْ	<i>Libanus mons ; libaniticus.</i>
لَادِيْسَهْ	لَادِيْسَهْ et لَادِيْسَهْ Leontinus seu Leo secundus imp.	لَاهَنْتَهْ	<i>Laurentius.</i>
لَادِيْسَهْ	لَادِيْسَهْ , pl. لَادِيْسَهْ Latinus.	لَوْجَدُونُهْ	<i>Lugdunum u. Galliae.</i>
لَادِيْسَهْ	لَادِيْسَهْ et لَادِيْسَهْ Lacedemon urbs.	لَهَنْتَهْ	<i>Leontius pr. m.</i>
		لَهَنْتَهْ et لَهَنْتَهْ كَهْمَهْ ; it.	<i>Khedâa , كَهْمَهْ</i>
		لَهَنْتَهْ et لَهَنْتَهْ كَهْمَهْ	<i>Lybia ; Libycus.</i>

كَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ et S. Longinus.
 كَهْلَفْتَهُ S. Longinuſ.
 كَهْلَفْتَهُ Lydda u. Palæstinæ.
 كَهْلَفْتَهُ Lydia provincia.
 كَهْلَفْتَهُ Loth nepos Abrahæ.
 كَهْلَفْتَهُ Levi, v. Diction.
 كَهْلَفْتَهُ وَمَا Longobardia provincia; كَهْلَفْتَهُ وَمَا Longobardi.
 كَهْلَفْتَهُ Lystræ u. Lycaonice.
 كَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ , كَهْلَفْتَهُ Lysias dux.
 لَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ Lysimachus.
 كَهْلَفْتَهُ Lysanias tetrarcha.
 كَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ S. Lucas Evangelista.
 كَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ Lycaonia regio.

كَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ S. Lu- cianus mart.
 كَهْلَفْتَهُ Lucius pr. m.
 كَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ Lia uxor Jacobi.
 كَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ S. Li- berius papa.
 كَهْلَفْتَهُ Libertini Judæi.
 كَهْلَفْتَهُ S. Linus successor S. Petri.
 كَهْلَفْتَهُ Laïs u. Palæstinæ.
 دَهْلَفْتَهُ Lachis u. Palæstinæ.
 كَهْلَفْتَهُ Lamech patriarcha.
 كَهْلَفْتَهُ et كَهْلَفْتَهُ Lemnos insula.
 حَدَّهُ , ut أَكْحَذَهُ Lazarus ; it. Lazarus pr. m.
 كَهْلَفْتَهُ , it. دَهْلَفْتَهُ Beth-La- petha, metropolis pror. Huzi- tarum(ar. الْأَخْوَاز).

خ

مَاهُورَا Magusa seu Famagusta u. Cypri.
 مَاهَدَرَان Mazendaran, ar.
 مَاهَدَرَان , مَاهَنَدَرَان regio Persidis.
 مَاهَمَا et مَاهَمَا Mammæa
 mater Alexandri Severi.
 مَاهَت et مَاهَت Manes haereticus;
 مَاهَت et مَاهَت Manichæi.
 مَاهَت et مَاهَت Manichæismus.
 مَاهَمَة , ar. مَاهَمَة , Masue medicus Syrus.

مَاهَهُ et مَاهَهُ S. Maro mona- chus; مَاهَهُ et مَاهَهُ Maronita.
 مَاهَهُ et مَاهَهُ S. Mares Aposto- lus Chalduorum.
 مَاهَهُ S. Marina virgo mart.
 مَاهَهُ S. Matthias Apost.
 مَاهَهُ , ar. مَاهَهُ , Mabug seu Hierapolis prope Euphra- ten.
 مَاهَهُ Nisibis u. Mesopota-

- | | |
|---|---|
| magie a Mygdonio flumine sic | مَهْمَنْتَ مَهْمَنْتَ Moyses ; مَهْمَنْتَ مَهْمَنْتَ Mosaicus. |
| appellata. | |
| Magog gens Scythica. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Mægistanus, |
| et مَهْمَنْتَ مَهْمَنْتَ مَهْمَنْتَ مَهْمَنْتَ | Almegistus liber Ptolemae de astronomia. |
| Magnesia urbs. | مَهْمَنْتَ مَهْمَنْتَ Majuma u. Palæstinæ. |
| v. Diction. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ S. Michael Archangelus. |
| Medaba u. Moabitidis. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Melita insula. |
| Media regio; et مَهْمَنْتَ مَهْمَنْتَ | مَهْمَنْتَ مَهْمَنْتَ Miletus u. Carice; |
| et مَهْمَنْتَ مَهْمَنْتَ Medus. | incola Mileti; it. et et مَهْمَنْتَ مَهْمَنْتَ Meletius. pr. m. |
| Modiath u. Mesopotamiæ. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ ar. مَهْمَنْتَ مَهْمَنْتَ Melitene seu Melita u. Arme- niae. |
| Mediolanum urbs Italiæ. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Milis pr. m. |
| Madian regio; مَهْمَنْتَ مَهْمَنْتَ | مَهْمَنْتَ مَهْمَنْتَ Melipora u. Indiae. |
| Madianita. | مَهْمَنْتَ مَهْمَنْتَ Mennas pr. m. |
| Memphis caput Egypti. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Mar- tyropolis u. Mesopotamiæ. |
| Moab pr. m. et regionis; | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Misael socius Danielis. |
| Moabita. | مَهْمَنْتَ مَهْمَنْتَ ar. مَهْمَنْتَ مَهْمَنْتَ Mesena caput Mesenæ regionis. |
| Mogulensis, Tartarus. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Mithridates rex. |
| Mondarus n. pl. regum Arabum. | مَهْمَنْتَ مَهْمَنْتَ ar. مَهْمَنْتَ مَهْمَنْتَ Mecca u. Arabie. |
| Montanus haereticus; | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Macedonius ha- resiarcha. |
| Montanista. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Maximus n. pl. virorum. |
| Moarrah u. Syriæ. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Maximianus imp. |
| ar. مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Mosul u. Mesopotamiæ ad Tigrim; et مَهْمَنْتَ مَهْمَنْتَ Mosulensis. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Maxentius imp. |
| Myra u. Cilicie. | مَهْمَنْتَ مَهْمَنْتَ et مَهْمَنْتَ مَهْمَنْتَ Maxentius imp. |

مَلَائِكَة	Malachias propheta.	مَهْمَّة	Mesa rex Moab.
مُلَانِيَا	S. Melania.	مَهْبَّة	الْمَقْدِيَّةُ , ar. , Arabes
مَلَكَّةٌ et مَلَكَّةٌ	Malabar regio indica.	مَاهِدَةٌ	Maadenses.
مَلَحَّةٌ et مَلَحَّا , مَلَحَّا	Malchus pr. m.	مَهْرَمَةٌ	Misraïm fil. Cham.
مَكَّهٌ	Moloch idolum.	مَهْرُوفٌ	Ægyptus a Misraïm sic vocata ; مَهْرُومًا Ægyptius.
مَكْسِيْدَه	Melchisedech rex et sacerdos.	مَهْمَّةٌ et مَهْمَّهُ	Macedonius heresiarcha ; مَهْمَّهُتَه et مَهْمَّهُتَه Mace- donii assecla.
مَلَفَّا et مَلَفَّا	Michol filia Saul.	مَهْمَّةٌ	Macedonia regio.
مَهْمَّهٌ	Menazdjerd n. Armeniae majoris.	مَهْمَّهٌ et مَهْمَّهُ	S. Macarius
مَهْمَّهٌ et مَهْمَّهٌ	Manahen pr. m.	مَهْمَّهُ	Macrinus imp.
مَهْمَّهٌ et مَهْمَّهٌ	Manen Comnenus imp.	مَهْمَّهُ	Dominus dedit, Maria- bus pr. m.
مَهْمَّهٌ et مَهْمَّهُ	Menelaus dux.	مَهْمَّهُ	Dominus noster vicit, Maranzacha pr. m.
مَهْمَّهٌ	Manahem rex Israel.	مَهْمَّهُ	Dominus noster cum eo, Maraname pr. m.
مَهْمَّهٌ	Masebdan, ar. regio Persidis.	مَهْمَّهٌ	Maras pr. m.
مَهْمَّهٌ	Mesopotamia regio inter Euphraten et Tigrim sita.	مَهْمَّهٌ	Maraga u. Maragam spectans.
مَهْمَّهٌ	Messias, Christus.	مَهْمَّهٌ et مَهْمَّهٌ	Margiana regio Persidis.
مَهْمَّهٌ	Massilia u. Galliae.	مَهْمَّهٌ	Marga u. Mesopotamiæ.
مَهْمَّهٌ	Mozambicha u. Africæ.	مَهْمَّهٌ et مَهْمَّهٌ	Marde seu Mardin, ar., u. Mesopotamiæ munita.
		مَهْمَّهٌ , ar. , مَرْزُ	Maru u. Chorasanæ ; مَهْمَّهٌ et مَهْمَّهٌ incola urbis Maru.

مَرْدَقْهُ وَهُبَّهُ et مَهْدَهُ مَهْدَهُ	Mero- dach rex Babylonis.
مَارُثَهُ س. Maruthas episc. Mar- tyropoleos.	
مَارْتِيَرْبُلْهُ وَهُبَّهُ كَعْصَهُ et مَنْهُهُ وَهُبَّهُ كَعْصَهُ	Martyropolis, ar. مَيَّا فَارِقَين, v. مَسْكَفَهُ .
مَارْتِنُ س. Martinus papa.	S. Martinus <i>papa</i> .
مَرِيَبَا مَهْرَبَا	Meriba <i>vicus</i> .
مَارِيَا مَهْرَبَا	Maria <i>n. Dei Genitricis</i>
B. V.; it. pr. plurium feminarum.	<i>B. V.; it. pr. plurium feminarum.</i>
مَارِيَا مَهْرَبَا	Mareia <i>tractus Egypti</i> .
مَارِهُسْ مَهْرَبَا	Marhes <i>u. Euphratesior.</i>
مَارِكُسْ مَهْرَبَا	S. Marcus <i>evangelista</i> .
مَارِشَهُسْ مَهْرَبَا	Marcianus <i>imp.</i>
مَارِشِيَرْهُ كَعْصَهُ	Marcion <i>haeresiarcha</i> .
مَارِشَنَوْلِهُ كَعْصَهُ	Marcianopolis <i>u. Mesiir.</i>
مَارِسَلُهُ كَعْصَهُ	Marcellus <i>episc.</i> <i>Ancyræ.</i>
مَارِسَلُنُهُ كَعْصَهُ	S. Marcellinus <i>papa</i> <i>mart.</i>
مَارِثَا مَهْرَبَا	S. Martha <i>soror Lazaris</i> .
مَاسِيُهُ	Masius <i>flumen Mesopota- miae.</i>
مَهْرُورُهُ	Moschorum gens.
مَاهَدَهُ وَهُبَّهُ كَعْصَهُ et مَهْدَهُ وَهُبَّهُ كَعْصَهُ	S. Methodius.
مَاهُهُهُ كَعْصَهُ	Mathusala <i>patriar- cha antediluvianus</i> .
مَاهُهُهُ كَعْصَهُ, ut مَهْهُهُ	S. Matthæus <i>Apost.</i>
مَاهَهُهُ كَعْصَهُ	Mathathias <i>pater Ma- chabeeorum.</i>

نَبَّاتٌ et نَبَّاتٌ Neocæsa-
rea u. Ponti.
نَبَّاتٌ et نَبَّاتٌ Nazianzum u.
Cappadociae.
نَبَّاتٌ Nain seu Naim pagus Ga-
lilææ.
نَبَّاتٌ Nan-King u. Sinarum.
نَبَّاتٌ Nero imp.
نَبَّاتٌ Nobe u. Palæstinæ.

نَبَائِوْتَةُ	Nabaioth fil. Ismaelis.	نَطْرَى نَطْرَى desertum Egypti.
نَهَائِيْسَهُ ، نَهَائِيْسَهُ ، نَهَائِيْسَهُ	, Novatus haeresiar-cha ; نَهَائِيْسَهُ Novatiani.	نِيلُ نِيلُ Nilus fl. Egypti; it.pr.m.
et نَهَائِيْسَهُ		نَهَاءَهُ et نَهَاءَهُ , ar. نَشْرَى , Ninive u. Assyrio.
نَهَاءَهُ	Nebo deus Chaldeorum ; it. نَهَاءَهُ Nobu u. regio-nis Moabitarum.	نَهَاءَهُ Ninus rex Assyriw.
نَهَاءَهُ	Nabuchodonosor rex Babylonis.	نَهَاءَهُ Nisabur u. Khorasane.
نَهَاءَهُ	Abigail.	نَهَاءَهُ et نَهَاءَهُ Nicæa u. Bithyniæ.
نَهَاءَهُ	Neptunus deus maris.	نَهَاءَهُ مَهْدُومَهُ et نَهَاءَهُ Nico-demus.
نَهَاءَهُ et نَهَاءَهُ	, ar. نَجْرَان , Nadjran u. Arabie Felicis.	نَهَاءَهُ Nicomedia u. Asie.
نَهَاءَهُ	Nadab f. Aaronis.	نَهَاءَهُ Nicopolis pr. pl. urbium.
نَهَاءَهُ	Nedoubel seu Gedeon judex Israel.	نَهَاءَهُ Nicator Seleucus.
نَهَاءَهُ	Nahravan u. Iracæ.	نَهَاءَهُ Nicetas pr. m.
نَهَاءَهُ	Nuhadra u. Mesopotamiæ.	نَهَاءَهُ et نَهَاءَهُ Nicephorus imp.
نَهَاءَهُ	Noe patriarcha ; نَهَاءَهُ Noachichus.	نَهَاءَهُ et نَهَاءَهُ S. Nicolaus episc. Myrorum.
نَهَاءَهُ	lumen, S. Lucius mart.	نَهَاءَهُ Nemrod rex Babylonis.
نَهَاءَهُ et نَهَاءَهُ	Numerianus imp.	نَهَاءَهُ et نَهَاءَهُ Nestorius haeresiarcha ; نَهَاءَهُ et نَهَاءَهُ Nestoriani : نَهَاءَهُ نَهَاءَهُ Nestorianismus.
نَهَاءَهُ	Numidia regio.	نَهَاءَهُ et نَهَاءَهُ Jephite judeo-Israël, cfr. نَهَاءَهُ.
نَهَاءَهُ	S. Nonnus episc.	نَهَاءَهُ Nephtali fil. Jacobi.
نَهَاءَهُ	Nonna pr. f.	نَهَاءَهُ et نَهَاءَهُ Nisibis u. Mesopotamiæ.
نَهَاءَهُ	Nonnosius dux.	نَهَاءَهُ Nazareth. u. Galilæa.
نَهَاءَهُ et نَهَاءَهُ	Nyssa u. Cappado-cia.	نَهَاءَهُ Mars planeta, cfr. ar. الْجَرَيْخَ .
الْعَيْرَيْتَةُ	Nozairii, ar. نَهَاءَهُ	نَهَاءَهُ Naasson fil. Aminadab.
نَهَاءَهُ	Nehemias dux.	
نَهَاءَهُ	Nachor avus Abrahæ.	
نَهَاءَهُ	Naasson fil. Aminadab.	

Ներիաս պատեր Բարուխ առաքալ
Նարսես և Նարսես Տէստ Նարսես թագավոր
Պէրսարում : Այս է Նարսես լեպո-
սոս, պօետ Սիրոս.

נַתְנָהּ Nathan propheta.
נַתְנָאֵל, **נַתְנָאֵל** et **נַתְנָאֵל**
Nathanael nom. S. Bartholomei Apost.

100

سَبَأ et **هَادِرًا** Saba pars Arabiae
meridionalis.

سقراط سocrates philos.

سَلْعَسْ سَلْعَسْ Salus seu simplex,
cogn. S. Simeonis Emeseni.

وَمِنْهُ فِي سِيْرَا et مِنْهُ فِي سِيْرَا Syria regio;

Samos insula.

سُرْيَانٌ Syrus, v. A.
سُرْيَانِيْم سُرْيَانِيْم Syriasmus;
Syriani seu Jacobitæ.

ستجرا و مقدونيا Stagyra u. Macedonia; ستجراتا Aristoteles.

Σεβαστή, Samaria ;
it., Σεβάστεια Sebastia u.
Armeniæ (hodie Siwas) ;
ίδια δένδρα incola Sebastiæ

سَطْفَانُوسُ الْمُقْتَلُوسُ، مُقْتَلُوسُ الْمُقْتَلُوسُ et S. Stephanus protomartyr.

~~et~~ Sodoma urbs;

Segestan, ar. سجستان, regio Persidis.

حَمَاهُمْ, **حَمَاهُهُ**, **حَمَاهُمْنَا**, **حَمَاهُهُمْنَا**

سُلَيْمَانٌ سِلَامٌ، سُلَيْمَانٌ مَكْحُونٌ et
سِلَامٌ مَكْحُونٌ S. Sylvester *papa.*

et سه و سه Severus patriarcha
monophysita ; سه و سه et سه و سه

سیلان Ceylan insula.
سیلمون Simon magus ; سیلمون سینا
et سیلمون سینما Simonis assecla,
Simonia cus

سَفِيلْيَانُ Severiani asseclæ.
سُولُونْ Solon legislator Atheniensis.

سیلیا Sicilia insula ; **سیلیوس** Siculus

سَمَّا مَدْحُودٌ et سَمَّا مَدْحُودٌ Sym-
machus

مَقْرُبًا ، مَدْنَمْلَى et
يَسَارِيُوتْ يَسَارِيُوتْ Iscariotes Judas

وَهْدَ *v. Diction.*

حُكْمٌ, حُكْمًا et حُكْمٍ, et حُكْمًا Seleucia u. Assurip.

三

אַבְדָמֶלֶךְ et אַבְדָמֶלֶךְ Gaza u. Palestinae, v. אַבְדָמֶלֶךְ et אַבְדָמֶלֶךְ .	אַבְדָמֶלֶךְ Abdamelech pr. m.
אַבְדָמֶלֶךְ servus, Abda pr. m. ; insuper præmittitur plur. nom.	אַבְדָמֶלֶךְ Abdenago nomen chald. Azarice socii Danielis.
אַבְדָמֶלֶךְ servus Jesu, Ebed- jesu pr. pl. virorum, inter quos eminet Ebedjesu Soben- sis scriptor.	אַבְדָמֶלֶךְ et אַבְדָמֶלֶךְ Ebed- schalum nomen Absalonis.
	אַבְדָמֶלֶךְ Abdu rex Edessæ.
	אַבְדָמֶלֶךְ Heber fil. Sale pr. m. ;
	אַבְדָמֶלֶךְ Hebræus, v. Diction.
	אַבְדָמֶלֶךְ Hebron, ut. סֵתְרָה .

جَهَّادٌ	Absalama pr. m.	جَهَّادٌ أُبُودٌ ، ar. الْجَهَادِيَّةُ ، Ammadiah u. Mesopotamiae.
جَهَّامٌ	Eglon rex Moab.	جَهَّامٌ Ammon pater Ammonitarum ; جَهَّامٌ Ammonita.
جَهَّادٌ	جَهَّادٌ et جَهَّادٌ Abdias propheta.	جَهَّادٌ et جَهَّادٌ Amos propheta.
جَهَّادٌ	Obed fil. Booz.	جَهَّادٌ Aminadab pr. m.
جَهَّادٌ	Og rex Bataneæ.	جَهَّادٌ Amalec pater Amalecitarum ; جَهَّادٌ Amelechita.
جَهَّادٌ	Audius hæreticus Edesenus.	جَهَّادٌ Emmanuel cogn. Christi, aliorumque post eum.
جَهَّادٌ	Ozias rex Juda.	جَهَّادٌ Amasa pr. m.
جَهَّادٌ	جَهَّادٌ , or. عَطَارِدٌ , Mercurius.	جَهَّادٌ Gomorrha urbs.
جَهَّادٌ	Hus regio transjordanis.	جَهَّادٌ Amri pater Achab regis.
جَهَّادٌ	جَهَّادٌ et جَهَّادٌ Azazel pr. m.	جَهَّادٌ et جَهَّادٌ Amran pater Mosis.
جَهَّادٌ	Esdras propheta.	جَهَّادٌ exaudivit me Jesus, vel nubes Jesu, Ananjesus, pr. m.
جَهَّادٌ	Azarias pr. pl. virorum.	جَهَّادٌ Anathoth u. Judææ.
جَهَّادٌ	Elam regio Persica ;	جَهَّادٌ Astarte seu Sidonia Venus.
جَهَّادٌ	جَهَّادٌ Elamita.	جَهَّادٌ Ephra fil. Midian. et n. regionis.
جَهَّادٌ	fons ; præfigitur multis nom. loc.	جَهَّادٌ Araba Mesopotamiae tractus ab Arabibus habitata.
جَهَّادٌ	Engaddi vinea celebris.	جَهَّادٌ v. Diction.
جَهَّادٌ	Endor loc.	جَهَّادٌ ut جَهَّادٌ Arabia regio ; جَهَّادٌ et جَهَّادٌ Arabs.
جَهَّادٌ	Aneyra u. Galatiae.	جَهَّادٌ Arlam vicus Palæstinæ.
جَهَّادٌ	Ain Rogel loc.	جَهَّادٌ et جَهَّادٌ , ar. التَّرِيشُ , Ares u. maritima inter Ægyptum et Palæstinam sita.
جَهَّادٌ	عَيْنَتَابٌ , Aintab u. prope Alepum.	
جَهَّادٌ	Isa, arabicum Jesu Christi nomen.	
جَهَّادٌ	Esaü frater Iacob.	
جَهَّادٌ	Acco seu Ptolemaïs u. Phœniciae (gall. St. J. d'Acre).	
جَهَّادٌ	Achor pr. m.	
جَهَّادٌ	Emmaus vicus.	

حاَمِلُ اسَاعِيلُ Asaël frater Joab.
حَدَّادُ اثَالِيَةً Athalia regina.

حَدَّادُ اثَنِيَلُ Othoniel fil. Cenez
pr. m.

٥

فَارَاتُ ، فَارَاتُ ، فَارَاتُ et ١٤٦ Patara
metrop. Lyciae.

فَارَكْمَهُ كَمْ بَعْدَ Palæologus.

فَارَنَهُسُ Pannonia regio.

فَارَنَهُسُ Panæas seu Cæsarea
Philippi.

فَارَقُ ، ar. بَارِقُ ، Perrha u. re-
gionis Euphratensis.

فَارَتُهُسُ et فَارَتُهُسُ S. Fabia-
nus popa.

فَارُ Fulco rex Jerosolymita-
nus (gall. Foulques).

فَارُهُسُ كَمْ et
فَارُهُسُ Puteoli u. Italiae.

فَارُهُسُ et فَارُهُسُ Photius patr.
Constantinopolitanus.

فَارُهُسُ et فَارُهُسُ Photinus
haereticus; فَارُهُسُ et

فَارُهُسُ Photini asseclæ.

فَارُهُسُ Putiphar princ. eunu-
chorum.

فَارُهُسُ Putiphra sacerdos
Hieropoleos.

فَارُهُسُ ، فَارُهُسُ et
فَارُهُسُ Paulus pr. plur.

inter quos primas tenet Apos-
tolus Paulus; فَارُهُسُ Pau-

linus seu ad Paulum perti-
neus; فَارُهُسُ Paulinista
seu Pauli Samosetani assecla.

فَارُهُسُ et فَارُهُسُ
Peloponesus regio.

فَارُهُسُ Plutarchus scri-
ptor.

فَارُهُسُ et فَارُهُسُ S. Pulcheria
imperatrix.

فَارُهُسُ et فَارُهُسُ Pompeius
dux.

فَارُهُسُ et فَارُهُسُ Pontus
regio.

فَارُهُسُ et فَارُهُسُ Phœnicia;
فَارُهُسُ Phœnicius.

فَارُهُسُ Alphonsus, ar. الْأَنْسُ .

فَارُهُسُ et فَارُهُسُ Phocas imp.

فَارُهُسُ Pharos insula.

فَارُهُسُ ، فَارُهُسُ et
فَارُهُسُ Porphyrius philo-
sophus.

فَارُهُسُ ، فَارُهُسُ etc.
Ptolomæus rex Egypti; it.

Ptolomæus Claudius nuctor
Almegisti.

فَارُهُسُ ، فَارُهُسُ et
فَارُهُسُ امْبَا

Ptolemaïs u. Phœniciae, v.	فَكْدُمْ فَكْدُمْ et فَكْدُمْ Philemon
خَنْخَه .	discipulus Pauli pr. m.
سَهْلَهْ فَهْ , it. فَلَاهْ مَهْ et فَلَاهْ s. Petrus Apostolorum princeps ; فَهْ مَهْ ad Petrum spectans.	فَكْدُفْهَهْ , فَكْدُفْهَهْ S. Philippus Apost. ; it. pr. pl. virorum.
سَهْلَهْ فَهْ et فَهْ مَهْ Petronica seu Protonica uxor christiana Claudii imp.	فَكْدُفْهَهْ Philippus u. Macedoniac ; فَكْدُفْهَهْ Philippensis.
فَهْ فَكْدُهْهْ , فَهْ فَكْدُهْهْ et فَهْ Patrophilus pr. m.	فَنِيَسْ فَنِيَسْ Phinees fil. Eleazaris.
فَهْ فَكْدُهْهْ , فَلَاهْ فَكْدُهْهْ Patricius pr. m.	فَهْ فَهْ فَهْ Festus Judææ procurator.
فَهْ فَكْدُهْهْ , فَهْ فَكْدُهْهْ Philagrius pr. m.	فَهْ فَهْ بِرْ بِرْ Pisidia regio Asiæ Minoris.
فَكْدُبْهْ فَكْدُبْهْ et فَكْدُبْهْ Philadelphus Ptolomæus rex.	فَهْ فَهْ , Pers. پیروز , Pheroz rex Persarum.
فَكْدُبْهْ فَكْدُبْهْ et فَكْدُبْهْ Philadelphia n. pl. urbius.	فَهْ فَهْ اَدَاب Pherozabad oppidum Iracæ.
فَكْدُهْهْ et فَكْدُهْهْ Philoxenus ep. Mabugensis monophysita.	فَهْ فَهْ مَادَهْ Pheroz-Sapor seu Anbara u. Iracæ.
فَكْدُهْهْ et فَكْدُهْهْ Philopator Ptolomæus rex Aegypti.	فَهْ فَهْ وَاسْ Pythagoras philosophus.
فَكْدُهْهْ et فَكْدُهْهْ Philoponus Joannes grammaticus.	فَهْ فَهْ سَهْ Pacomius monachus.
فَكْدُهْهْ et فَلَاهْ فَلَاهْ Pilatus Judeææ procurator.	فَلَاهْ فَلَاهْ سَهْ S. Flavianus episc. Antiochenus.
فَكْدُهْهْ et فَلَاهْ فَلَاهْ Felix Juðææ procurator.	فَكْدُهْهْ فَكْدُهْهْ Phaleg fil. Heber.
	فَكْدُهْهْ فَكْدُهْهْ et فَكْدُهْهْ Pelagius haeresiarcha.
	فَلَاهْ فَلَاهْ et فَلَاهْ فَلَاهْ Palladius pr. plur. virorum.
	فَكْدُهْهْ فَكْدُهْهْ et فَكْدُهْهْ Florentius pr. m.
	فَلَاهْ فَلَاهْ et فَلَاهْ Plato philosophus.

فَلَدْمَهُؤَا فَلَدْمَهُؤَا, فَلَدْمَهُؤَا
Palmyra.

فَلَدْمَهُؤَا, فَلَدْمَهُؤَا et فَلَدْمَهُؤَا
it. فَلَدْمَهُؤَا, فَلَدْمَهُؤَا Pa-
laestina ; فَلَدْمَهُؤَا Palæstinus ;
فَلَدْمَهُؤَا Philistæus.

فَمَدْهُؤَكْهُسْ it.
فَمَدْهُؤَكْهُسْ, et فَمَدْهُؤَكْهُسْ Pamphilus pr. m.

فَمَدْهُؤَكْهُسْ et فَمَدْهُؤَكْهُسْ Pamphilia
regio Asie.

فَنْتَا, فَنْتَا et فَنْتَا Phenenna
uxor Elcanæ.

فَنْتَا افْهَكْهُسْ Pentapolis regio
Cyrenaïcæ.

فَنْتَهُؤَكْهُسْ Pontius Pilatus.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ S. Panta-
leo martyr.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ Phostat nom. antiqu. Cairi.

فَنْتَهُؤَكْهُسْ Paphos insula.

فَنْتَهُؤَكْهُسْ S. Papias mart.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ Paphla-
gonia regio.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ Paphnutius
pr. pl. virorum.

فَنْتَهُؤَكْهُسْ Phacee rex Israel.

فَنْتَهُؤَكْهُسْ Phaceia dux.

فَنْتَهُؤَكْهُسْ Pacorus rex Edessæ.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ et
فَنْتَهُؤَكْهُسْ Probus imp.

فَنْتَهُؤَكْهُسْ et
فَنْتَهُؤَكْهُسْ Pergama urbs.

فَنْتَهُؤَكْهُسْ, pers. Aphra-
ates sapiens, v. فَنْتَهُؤَكْهُسْ .

فَنْتَهُؤَكْهُسْ Provincia regio in
Gallia (gall. Provence).

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ Phrygia regio
Asie Minoris ; فَنْتَهُؤَكْهُسْ Phry-
gius.

فَنْتَهُؤَكْهُسْ Pharzamana u. Arme-
niæ (hodie Marsivan).

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ Fortunatus.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ Pertinax imp.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ S. Proterius
episc. mart.

فَنْتَهُؤَكْهُسْ S. Primus mart.

فَنْتَهُؤَكْهُسْ Priscus pr. m.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ Priscilla pr. f.

فَنْتَهُؤَكْهُسْ Pericles Athenien-
sis.

فَنْتَهُؤَكْهُسْ et فَنْتَهُؤَكْهُسْ Francia regio ;
فَنْتَهُؤَكْهُسْ Francus ; Euro-
pæus.

فَنْتَهُؤَكْهُسْ S. Franciscus.

فَنْتَهُؤَكْهُسْ ar. فَارس , Persia ;
et فَنْتَهُؤَكْهُسْ Persicus, Persa.

فَنْتَهُؤَكْهُسْ Pharao rex Egypti.

فَنْتَهُؤَكْهُسْ Phares f. Judæ fil. Ja-
cobi.

فَنْتَهُؤَكْهُسْ Pharisæus, v. Diction.

فَنْتَهُؤَكْهُسْ ar. فَرات , Euphra-

tes fl. Mesopotamiae; إِمْرَأَةٌ فَرَّاتَيْنِيَّةٌ	وَلَهُ فَرَّاتَةٌ et فَرَّاتَةٌ Parthia regio.
Perath Mesena u. Irace.	فَرَّاتَةٌ مَسِنَةٌ Phetros Agyptus superior.

ج

رَحْتَا, ar. الصَّابِيَّةِ, Sabaei sen Mandaïtæ.

زَوْهَدٌ Sadoc sacerdos.

زَوْهَمَّا Sedecias rex Juda.

زَوْهَمَّهُ Sion arx Jerosolymæ.

زَوْهَمَّهَنَّا Sionita Gabriel Scriptor Maronita.

زَوْهَنْتَا Soba u. Syriæ; it. Nisibis u. Mesopotamiae;

زَوْهَنْتَا Sobensis, Nisibenus.

زَوْهَنْتَى Sophene regio.

زَوْهَنْقَسْتَا et قَنْتَمَا Sophonias propheta.

زَوْهَنْقَفْتَا Sephor pr. m.

زَوْهَنْجَرْتَا Tyrus u. Phœniciae; لَهُ زَوْهَنْجَرْتَا Tyrius.

زَوْهَنْجَرْهَا Saura u. Mesopotamiae.

زَوْهَنْجَنْهَا Siba pr. m.

زَوْهَنْجَنْبَنْهَا Sidon pr. m. et urbs Phœniciae; لَهُ زَوْهَنْجَنْبَنْهَا Sidonius.

زَوْهَنْجَنْهَنْهَا Sin desertum Petroeæ; it. et قَنْهَنْهَنْهَا Sina regio; رَمَنْتَهَا Sinensis.

زَوْهَنْجَنْهَنْهَا crux, Sliba pr. m.

زَوْهَنْجَنْهَنْهَا et قَنْهَنْهَنْهَا crux vicit, Sliba-Zacha patriarcha.

زَوْهَنْجَنْهَنْهَا Salaha u. Mesopotamiae; رَكْسَتَا ex urbe Salaha.

زَوْهَنْجَنْهَنْهَا Salmon pr. m.; it. mons Selmon.

زَوْهَنْجَنْهَنْهَا Soan seu Tanis u. Agypti.

زَوْهَنْجَنْهَنْهَا Segor urbs.

زَوْهَنْجَنْهَنْهَا Sephora uxor Mosis.

زَوْهَنْجَنْهَنْهَا Sephoris urbs Galileeæ.

زَوْهَنْجَنْهَنْهَا S. Sophronius.

زَوْهَنْجَنْهَنْهَا Sarepta urbs prope Sidonem; لَهُ زَوْهَنْجَنْهَنْهَا Sareptanus.

ه

زَوْهَنْجَنْهَنْهَا, ar. الْقَاهِرَةُ, Cairus metrop. Agypti.

زَوْهَنْجَنْهَنْهَا et قَنْهَنْهَنْهَا Catana u. Siciliæ.

زَوْهَنْجَنْهَنْهَا Cain primogenitus Adami.

Capua u. Italiæ.

مَدْنَه . v. مَدْنَه .

مَدْنَه , v. Diction.

مَدْنَه Cedar fil. Ismaelis.

مَدْنَه Cedron torrens.

مَدْنَه Cades u. Palæstinæ.

مَدْنَه , v. Diction.

مَدْنَه , pl. مَدْنَه Quadorum gens.

مَدْنَه Quartus discipulus.

مَدْنَه et مَدْنَه Cuzhaia, cœnobium Maronitarum in Libano.

مَدْنَه Cyzicus u. Mysiae.

مَدْنَه S. Cosmas mart.

مَدْنَه et مَدْنَه Quintus pr. m.

مَدْنَه et مَدْنَه Colossus u. Phrygiæ; et مَدْنَه Colossensis.

مَدْنَه statura, Cauma pr. m.; it. Cumæ u. Toscanæ.

مَدْنَه surrexit Jesus, Com-jesus pr. m.

مَدْنَه et مَدْنَه Comana u. Ponti.

مَدْنَه Commodus imp.

مَدْنَه et مَدْنَه Comnenus Alexius imp.

مَدْنَه Conus episc.

مَدْنَه Cynopolis u. Egypti.

مَدْنَه et مَدْنَه Iconium metropolis Lycaoniæ.

مَدْنَه et مَدْنَه Constantius imp.

مَدْنَه et مَدْنَه Constantinus imp.

مَدْنَه et مَدْنَه Constantinopolis. Cons-tans imp.

مَدْنَه Constantia u. Cypri.

مَدْنَه et مَدْنَه Cyprus insula.

مَدْنَه et مَدْنَه S. Cyprianus episc. Carthaginensis.

مَدْنَه et مَدْنَه Cyrus rex Persarum.

مَدْنَه Cyra insula.

مَدْنَه Core Mosis adversarius.

مَدْنَه et مَدْنَه Cyrillus pr. pl. episcop. inter quos eminent S. Cyrillex Alexandrinus.

مَدْنَه et مَدْنَه Cyrene u. Africæ.

مَدْنَه Quirinus Syriæ præ-fectus.

مَدْنَه et مَدْنَه Corinthus u. Græcicæ: Corinthius.

مَدْنَه et مَدْنَه , مَدْنَه

Cyriacus pr. pl. virorum.	كَرِيَّا، ar. قُرَيْشٌ، Koreisch	Callisura u. Arme- niæ.
مُهَمَّةٌ، ar. قُرَيْشٌ، Koreisch tribus arabica.	مُهَمَّةٌ كُنْكُمَّهٌ et مُهَمَّةٌ كُنْكُمَّهٌ Cornelius centurio.	مُكْنَسٌ س. Callistus papa.
فَزُونٌ et فَاهَمٌ، ar. Cas- vin u. prope mare Caspium.	فَزُونٌ et فَاهَمٌ، ar. Cas- vin u. prope mare Caspium.	مُكْلَسٌ Callistratus mart.
مُهَنَا Cana vicus Calilææ.	مُهَنَا Catara u. Mesopotamiae, al. insula Socotoræ.	مُكْلَسٌ Colchorum gens.
مُكْمَمًا Cilicia regio.	مُكْمَمًا Kin u. Judææ; مُكْمَمًا et مُنَتَّا Kinita seu Cinæus.	مُكْلَسٌ et مُكْلَسٌ مُكْلَسٌ et M. Chalcedon u. Bithyniæ, v. مُكْلَسٌ.
مُكْمَمًا	مُكْمَمًا et مُكْمَمًا Cainan patriarcha.	مُكْلَسٌ et مُكْلَسٌ Cades cas- trum.
مُكْمَمًا	مُكْمَمًا Caiphas Sacerdos Judæo- rum.	مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et S. Cælestinus papa.
مُكْمَمًا Cis pater Saülis.	مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et Claudia pr. f.	مُكْلَسٌ Celer pr. m.
مُكْمَمًا	مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et Claudius imp.	مُكْلَسٌ et مُكْلَسٌ et Candace seu Æthiopia regio.
مُكْمَمًا	مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et Claudianus pr. m.	مُكْلَسٌ Conon pr. m.
مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et Celta, Celticus.	مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et Cleophas pr. m.	مُكْلَسٌ et مُكْلَسٌ et Canatha u. Arabiæ.
مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et S. Clemens.	مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et Climacus S. Joannes.	مُكْلَسٌ et مُكْلَسٌ et Kenaz pr. m.
مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et Callinieus u. Mesopotamiae (ar. الرَّقَّةِ);	مُكْلَسٌ et مُكْلَسٌ et مُكْلَسٌ et etc., Callinicensis.	مُكْلَسٌ et مُكْلَسٌ et Cetura uxor Abrahā- mi; tribus inde exortæ.
		مُكْلَسٌ et مُكْلَسٌ et Cenchræ u. prope Corinthum.
		مُكْلَسٌ et مُكْلَسٌ et قَنَسْرِينِ، ni- dus aquilarum, Kennesrin seu Cansara u. ad Euphratem.
		مُكْلَسٌ et مُكْلَسٌ et Constans fil. Lucæ scriptor celeber.
		مُكْلَسٌ et مُكْلَسٌ et Cassianus pr. m.

رَبْعٌ	Rebe <i>rex Median.</i>	رَبْعٌ	res urbes <i>Palestine;</i> رَبْعٌ
رَجْمٌ	Regium <i>u. Italie.</i>	رَجْمٌ	urbs <i>Jerusalem.</i>
رَاغِشٌ	Raghes <i>pr. m.</i>	رَاغِشٌ	رَامَةُ الْجَلَادِ
رَمَّا	رَمَّا et رَمَّا	رَمَّا	Ramath <i>Galaad</i> <i>u. Galaaditis.</i>
رَمَّا	Roma <i>metropolis Italie;</i> رَمَّا et رَمَّا, v. <i>Diction.</i> ; it. رَمَّا Romanus;	رَمَّا	Ramathaim <i>u. Palæ-</i> <i>stine.</i>
رَمَّا	Romanismus <i>seu ro-</i> <i>manus mos.</i>	رَمَّا	Rasan <i>nomen Ctesiphontis.</i>
رَبْعٌ	Ruben <i>fil. Jacobi.</i>	رَبْعٌ	رَجَلُ إِسْرَائِيلٍ et رَجَلُ إِسْرَائِيلٍ Raguel <i>fil.</i>
رَهْدٌ	Rhodus <i>insula.</i>	رَهْدٌ	<i>Esau.</i>
رَمَّا	Romelia <i>pater Phacees</i> <i>regis Israel.</i>	رَهْدٌ	Ruth <i>Midianitis.</i>
رَمَّا	Romanus <i>imp. Constantinop.</i>	رَهْدٌ	Ragma <i>urbs.</i>
رَفَعٌ	Rapha <i>pr. pers. et loci.</i>	رَهْدٌ	رَاهْمَا Raamia <i>pr. m.</i>
رَفَعٌ	Rufus <i>pr. m.</i>	رَهْدٌ	Raphael <i>Archangelus.</i>
رَهْبَانٌ	Rahab <i>pr. f.</i>	رَهْدٌ	Raphaim <i>gigantes.</i>
رَهْبَانٌ	الرَّجْبَةُ, ar. Rahba <i>u.</i>	رَهْدٌ	Raphad <i>u. Mesopotamiae.</i>
	<i>Mesopotamie;</i> رَهْبَانٌ ex urbe	رَهْدٌ	Raphaia <i>pr. m.</i>
	Rahba.	رَهْدٌ	Raphidim <i>locus prope</i> <i>Sinai.</i>
رَهْبَانٌ	رَهْبَانٌ et رَهْبَانٌ Roboam <i>rex</i>	رَهْدٌ	Rebecca <i>uxor Isaaci.</i>
	<i>Juda.</i>	رَهْدٌ	Rasin <i>rex Syriæ.</i>
رَهْبَانٌ	Rachel <i>uxor Jacobi.</i>	رَهْدٌ	رَهْبَانٌ, ar. رَهْبَانٌ, Respha <i>u.</i>
رَهْبَانٌ	Resena <i>u. Mesopotamiae.</i>	رَهْدٌ	<i>Mesopotamiae.</i>
رَهْبَانٌ	Ram <i>pater Aminadab.</i>	رَهْدٌ	Raspha <i>uxor Saulis.</i>
رَهْبَانٌ	Rama <i>vel Ramatha plu-</i>	رَهْدٌ	Recem <i>u. Palæstine;</i> it.
	<i>træe.</i>	رَهْدٌ	Recem <i>rex Madian.</i>

س

سَابِعٌ	Saul <i>rex.</i>	سَابِعٌ	Saba <i>pr. m.</i>
سَابِعٌ	Saba <i>regio Arabiæ Felicis.</i>	سَابِعٌ	Sabathias <i>pr. m.</i>

- سِنْجَار** et سِنْجَار مُحَمَّدٌ , ar. سِنْجَار , Singara u. Mesopotamiae.
- سِدْرَاء** Sidrac cogn. Ananias socii Danielis.
- سُوكَار** Sua rex Egypti.
- سُوبَال** Sobal pr. m.
- سُوَفَر** Sue f. Abrahami et Ceture.
- سُورَا** Assyria ; مُهُوفَةً Assyrius.
- سُوزَة** Suza u. Persidis.
- سُوزَانَة** et سُوزَانَة Suzanna pr. f.
- سُوسَر** Tustar, ar. شَشَر , u. Iracæ.
- سَهَيْزَر** Schaizar, ar. شَهَيْزَر u. Syriæ ad Orontem.
- سَهُور** Sehor urbs ; it. Gehon fluvius.
- سِيلَاس** et سِيلَاس Silas discipulus.
- سِيلَوَة** Siloe fons.
- سُونَام** Sunam u. prope Hermon ; مُكَهَّمَةً Sunamitis.
- سَمَاء** et سَمَاء Sem fil. Noe.
- سَكِيكَهان** Genkikhan seu Gen-giskhan Mogulorum rex.
- سَقَهَا** Schecha u. Phœnicior.
- سِقَمَه** Sichem u. Samaritæ.
- سَلَاهَا** Sala regio (antiquum nomen Japonicæ).
- سَلَومَه** Salome Maria.
- سَلَيْهَا** praefectus, Schalita seu S. Artemius martyr.
- سَلَمَه** Salem u. Jerusalem anti-quitus ; it. pr. m. ar. مُكَهَّمَه et مُكَهَّمَه Salomon rex.
- سَلَامِيَه** Salamiel pr. m.
- سَمَمَه** Semma pr. m.
- سَمَغَر** Samgar judex Israel.
- سَعَمَه** Samuel propheta.
- سَهَامُونِي** Schamouni mater septem fil. Machabœorum.
- سَمِير** Samir mons in tribu Ephraim.
- سَمِير** Samir levita.
- سَمَوَاتِاط**, مُكَهَّمَه et مُكَهَّمَه , ar. سَمَوَاتِاط , Samosata u. ad Euphratem.
- سَمِون** Simon vel Simeon pr. plur. vir inter quos eminet Simon Petrus; it. Simon Magus; مُكَهَّمَه Simoniacus ; مُكَهَّمَه simonia.
- سَمَئَل** et سَمَئَل Semei pr. m.
- سَمَيَاه** Semeias, pr. m.
- سَامَارِيَه**, f. سَامَارِيَه مُكَهَّمَه ; it. سَامَارِيَه Samaritanus ; سَامَارِيَه حَمَدَه سَامَارِيَه سَامَارِيَه secta seu haeresis Samaritanorum.
- سَامَارِيَه** Samaria metrop. Samariæ.
- سَامُون** Samson Judex Israel.
- سَافِرَه** pulchra, Saphira uxor Ananias, cfr. مُهُوفَةً .
- سَفَهَن** Sephon pr. m.
- سَرَبَل** S. Sarbel mart. Edes-senus.
- سَارُون** Saron regio ; it. n. urbis.
- سَارَاهِيَه** Saraias pr. m.

1

- | | | | |
|-----------------|--|-----------------|---|
| أَحْمَدُ | Thabor mons Galileeæ. | أَنْصَرُ | Theman ; it. Australis regio ; Arabia Felix. |
| إِسْتَادُ | Lincolæ Thebaidis. | إِبْرَاهِيمٌ | Tamuz idolum Syrorum (Adonis) ; Mars planeta. |
| هُوَدُونْ | Theodorus pr. pl. virorum. | إِسْكَنْدَرَيَا | Thessalonica urbs ; Thessalonicensis. |
| إِسْتَادُ | S. Theodora pr. f. | إِفْرَادُ | Taphar u. Arabiæ Felicis. |
| إِسْتَادُ | Thyatira u. Asice. | إِسْكَنْدَرَيَا | Thecua urbs Palæstinæ. |
| إِسْكَنْدَرَيَا | et مُهَمَّدٌ, مُوسَى, مُحَمَّدٌ, مُهَمَّدٌ et مُهَمَّدٌ S. Thomas Apost. | الْجَلْسَلُ | collis, præfigitur multis nom. locorum. |
| إِسْكَنْدَرَيَا | Theophilus episc. Alexandrinus. | تَلْ بَاسِرٌ | ارخ دامن, ar. تل بامر, Tel-Baser, arx Syriæ munita. |
| إِسْكَنْدَرَيَا | et إِسْكَنْدَرَيَا S. Thecla virgo martyr. | تَلْمَاهَرُ | Telmahar u. Mesopotamia. |
| إِسْكَنْدَرَيَا | Thebæ urbs Egypti. | تَانْجُوتُ | Tangut provincia Thibeti. |
| إِسْكَنْدَرَيَا | et إِسْكَنْدَرَيَا Thebais regio Egypti. | تَانِيسُ | et تَانِيسُ Tannis u. Egypti inferioris. |
| إِسْكَنْدَرَيَا | Teghlat-Phallassar rex Babylonice. | ثَارَ | Thare pater Abraham. |
| إِسْكَنْدَرَيَا | S. Thaddæus Apost. | تُورْكِيَا | Turcia regio ; قُوْمَانْ et قُونْتَانْ Turcomanus. |
| إِسْكَنْدَرَيَا | Tubal pr. ; it. n. regionis. | تَافِيسُ | Taphis seu Taphnis u. Egypti. |
| إِسْكَنْدَرَيَا | et إِسْكَنْدَرَيَا Tholmai pr. m. قُونْتَانْ et قُونْتَانْ Turco-marus. | ثَارْسِيزُ | Tharsis regio maritima. |
| إِسْكَنْدَرَيَا | Taphis seu Taphnis u. Egypti. | ثَسْبَا | Thesba u. Palæstinæ. |

عَدْم حُكْمِ وَفُرْقَةٌ وَلَا كُلُّهُمَا

۱۰۰۰ میلادی | موسیٰ مدد و مددی | مدد

A. M. D. G.

ERRATA

Pagina	col.	lin.	pro	rescribe
3	1	5	cfr. حَدَّا	حَدَّا
4	2	22	أَبْوَمُهْلًا	أَبْوَمُهْلًا
16	1	1	إِسَّ	إِلَّا
18	1	31	أَكْرَمَانَا	أَخْرَمَانَا
19	2	24	حَدَّمُصَّ	حَدَّمُصَّ
20	1	27	أَمْنَةٌ إِنَّا	أَمْنَةٌ إِنَّا
28	1	1	إِفَّ	إِلَّفَ
"	"	28	مُرْفُ، v. أَزْفَ	مُرْفُ، v. أَزْفَ
32	2	15	أَعْدَمَ	أَعْدَمَ
35	2	3	حَنَّه	أَحْنَه
43	1	13	حَدَّادَانَا	حَدَّادَانَا
"	2	20	Pa. حَادَفَ	Pa. حَادَفَ
45	2	21	f. أَحَدَادَتَ	f. أَحَدَادَتَ
46	1	1	حَدَا	حَدَا
51	2	6 et 9	حَمَّنَا	حَمَّنَا
54	2	13	نُحْرَةٌ	نُحْرَةٌ

(quæ forma intransitiva est).

"	"	21	fuit.	fui.
56	2	13	f. حَذَّمَانَا	حَذَّمَانَا
"	"	13	حَذَّهَتْ	حَذَّهَتْ
57	1	5	clitella	clitellæ
64	"	26	أَنْوَنْ كَرَّ	أَنْوَنْ كَرَّ
71	1	9	مَهَلَّا	مَهَلَّة
76	2	5	حَنْتَ مَنْ	حَنْتَ مَنْ
81	2	4 - 5	adv. clare	deleatur
"	"	16	جَرِيدَ	جَرِيدَ
82	1	11	adv. certo	deleatur
85	2	8	أَنْكَرَتْ	أَنْكَرَتْ
88	1	19 - 20	imper. وَكَرْهَةٌ	imper. وَكَرْهَةٌ


Pagina	col.	lin.	pro	rescribe
89	1	21	وَحْتَدَا	وَحْتَدَا
“	2	19	مُهَوْكَنْتَا	مُهَوْكَنْتَا
90	2	17	وَهَنْدَا	وَهَنْدَا
“	“	26	بُهْلَلْتَا	بُهْلَلْتَا
92	1	16	حَمَّهْ وَسْنَا	حَمَّهْ وَسْنَا
93	2	2	Ethpe. إِثْپَهْ وَمَعْ	Ethpe. إِثْپَهْ وَمَعْ
“	“	4	أَلَّا وَمَعْ	أَلَّا وَمَعْ
94	1	18	بِسَلْلَا	بِسَلْلَا et بِسَلْلَا
106	2	1	بَحْرَهْ	بَحْرَهْ
107	2	1	بَحْرَهْ	بَحْرَهْ
114	1	12	vel أَحْتَنْ	vel أَحْتَنْ
115	2	24	retrogressus	retrogressu
116	1	1	بَفْهَهْ	بَفْهَهْ
116.	2	5	مُهَمْهَهْ وَهَنْهَهْ	مُهَمْهَهْ وَهَنْهَهْ
120	1	1	بَهْ	بَهْ
“	2	2 - 3	بَهْتَا دَهْبُهَا	بَهْتَا دَهْبُهَا
121	2	25	emptiso ; re	emptio; res
135	1	31	أَهْمَا ; m.	أَهْمَا , f.
136	1	15	أَفْحَدْ	أَفْحَدْ
151	1	2	سُكَّهْ وَهْ	سُكَّهْ وَهْ
153	1	15	سَهْلَا وَهَنْتَا	سَهْلَا هَنْتَا
167	1	2	dim. præc	dim. سَهْنَا
“	2	20	accepit	accipit
169	2	2	مَحَلَّ مَقْنَهْ	مَحَلَّ مَقْنَهْ
171	2	1	سَهْ	سَهْ
186	1	23	لَهْ لَهْمَهْ	لَهْ لَهْمَهْ
187	1	12	لَهْ قَلَوْمَهْ	لَهْ قَلَوْمَهْ
“	“	22	præfectus	præfectus
195	1	1	بَهْ	بَهْ
201	2	28	بَرَرْ	بَرَرْ
206	1	29	مَهْكَنْتَا	مَهْكَنْتَا
209	2	26	voc. بَهْ مَهْ (iota)	voc. بَهْ مَهْ (iota)

Pagina	col.	lin.	pro	rescribe
225	2	8	ف.	فَلْ
229	2	13	فِي وَهُوَ	فِي وَهُوَ
233	2	17	erodius	herodius
238	2	31	فَكَتَنَهُ etc.	فَكَتَنَهُ etc.
243	2	15	فَلَمْهَهُ	فَلَمْهَهُ
248	1	28	Ethpe.	Ethpa.
"	"	31	consentient	consenserunt
254	1	3	حَفَّمَهُ	حَفَّمَهُ
"	"	15	Part. pass.	Part. act.
274	2	31	finut	fiunt.
297	2	9	balaustion	cancelli
				(gall. balustrade).
298	2	2	لَعْدَهُ	لَعْدَهُ , fut.
314	1	22	مَلْعُونَهُ	مَلْعُونَهُ
315	2	4	v. s.	v. s.
320	1	17	مَحْبَّهُ	مَحْبَّهُ , al.
329	1	17	مَرْغَلِيَّة	מַרְגָּלִיָּה
"	2	26	تُنْ	تְּנָ
337	1	32	juvensut	juventus
365	2	13	purru	purus
369	1	32	خَنْجَفُ	خَنْجَفُ
372	1	20	إِسْنَمَهُ	إِسْنَمَهُ
375	1	21	مَحْلَهُ ... فَوَهُ	مَحْلَهُ ... فَوَهُ
378	1	5	aflifix	aflifixit
381	1	18-19	lucidississimus	lucidissimus
"	"	20	مَقْرَبَهُ	مَقْرَبَهُ , fut.
385	2	17	مَقْرَبَهُ	مَقْرَبَهُ , fut.
397	1	6	مَلْهَأً	مَلْهَأً
412	1	20	مَفْعَمَهُ	مَفْعَمَهُ
418	1	4	جَهَنَّمَهُ	جَهَنَّمَهُ
423	1 et 2	1	أَهَمَهُ	أَهَمَهُ
442	1	20	خَانَهُ	خَانَهُ

Pagina	col.	lin.	pro	rescribe
449	2	13	حَدَّهُ مَلٌ	حَدَّهُ مَلٌ
455	1	5	imp. pl.	imp. pl. formæ Palestinensis
484	2	24	فُسْ	فُسْ, fut.
495	1	26	qua	quibus
503	1	18	adiit	adi
“	2	5	فَكَدْ دَفَعْ	فَكَدْ دَفَعْ
507	2	7	فَسَهْ وَقَمْ مَلٌ كِبَرْرَاهِيَّا	فَسَهْ وَقَمْ مَلٌ كِبَرْرَاهِيَّا
510	2	8	جُبَانَا	جُبَانَا
511	1	15	pers.	بَشَّرُ
538	1	6	nihil	nihil
544	2	12	cfr.	cfr.
560	1	31	צָרֶה	צָרֶה
564	2	2	מַחְטֵה	מַחְטֵה
“	“	3	sensus	census
566	2	18	حَسَدَةَ حَسَدٍ	حَسَدَةَ حَسَدٍ
569	1	11	coarcervatus	coarcervatus
576	1	3	cfr.	a rad.
586	1	26	مَكْنَهْ وَمَنَا	deleatur
591	2	20	مَامُهْ, v., مَسْفَهْ	ut مَامُهْ
592	1	13	مُعَلَّهْ	مُعَلَّهْ
605	2	28	herinaceus	herinaceus ; bubo
610	1	16	it. vermis.	فُوهُرًا in h. sensu
615	1	“	فَهْ وَمَكْسَ	فَهْ وَمَكْسَ
616	“	19	وَسَلَلَا	وَسَلَلَا
626	2	26	حَدَّ لَأْوَحَدَا	حَدَّ لَأْوَحَدَا
633	1	10	ivit	ivit
638	1	2	oblatio	ablatio
645	1	8	أَلَّا مَفَ	أَلَّا مَفَ
648	1	29	v. s. مَهْوَ	s. مَهْوَ ante
“	“	30	فَخَا	تُخَا, fut.
660	2	19	مَحْكَمَهْ	مَحْكَمَهْ

Pagina	col.	lin.	pro	rescribe
665	2	18	جُرْدٌ	جُرْدًا
667	1	22	جَمِيْلٌ	جَمِيْلًا
672	1	15	Ethpe.	Eschtaiphel
670	1	7	cfr. حَسْ	cfr. حَسْ
686	1	24	جَهْدٌ fut. نَعْدَهُ فِ	جَهْدٌ fut. نَعْدَهُ فِ
692	1	23	شَبَّابٌ	شَبَّابٌ
702	1	4	جَنْفَرٌ	جَنْفَرًا
709	1	18	أَحْكَمٌ	أَحْكَمًا
713	1	18	أَسْكَمٌ	أَسْكَمًا
716	2	9	أَهْدَى	أَهْدَى
718	2	21	reddit	reddidit
727	2	9	illæ duo	illæ duæ
738	2	24	صَدٌ أَوْهَمٌ	صَدٌ أَوْهَمٌ
739	2	22	حَكَهُرُوفٌ	حَكَهُرُوفٌ
749	2	15	جُهْدٌ مُؤْجَدٌ	جُهْدٌ مُؤْجَدٌ
750	1	14	كَهْوَمٌ etc	deleatur
«	«	26	لَاهُ كَهْنَهَهٌ	لَاهُ كَهْنَهَهٌ
«	2	13	كَهْنَهَهٌ	كَهْنَهَهٌ
752	2	«	كَهْنَهَهٌ	كَهْنَهَهٌ
«	«	33	Maxentius	Maximinus





LaSyr
B894d

98438

Author Brun, J.

Title *Dictionarium Syriaco-Latinum.*

University of Toronto
Library

DO NOT
REMOVE
THE
CARD
FROM
THIS
POCKET

Acme Library Card Pocket

Under Pat. "Ref. Index File"

Made by LIBRARY BUREAU

